

Holy Bible

Aionian Edition®

ગુજરાતી
Sanskrit New Testament, Gujarati

AionianBible.org

વિશ્વનું પ્રથમ પવિત્ર બાઈબલ રિવર્સ અનુવાદ

કૌપિ અને છાપવા માટે 100% મફત

તરીકે પણ જાણીતી “ જાંબલી બાઈબલ ”

Holy Bible Aionian Edition ®

गुजराती

Sanskrit New Testament, Gujarati

CC Attribution ShareAlike 4.0, 2018-2024

Source text: eBible.org

Source version: 2/21/2024

Source copyright: CC Attribution ShareAlike 4.0

SanskritBible.in, 2018

Formatted by Speedata Publisher 4.19.2 (Pro) on 4/23/2024

100% Free to Copy and Print

TOR Anonymously

<https://AionianBible.org>

Published by Nainoia Inc

<https://Nainoia-Inc.signedon.net>

We pray for a modern public domain translation in every language

Report content and format concerns to Nainoia Inc

Volunteer help is welcome and appreciated!

Celebrate Jesus Christ's victory of grace!

પ્રસ્તાવના

ગુજરાતી at AionianBible.org/Preface

The *Holy Bible Aionian Edition* ® is the world's first Bible *un-translation*! What is an *un-translation*? Bibles are translated into each of our languages from the original Hebrew, Aramaic, and Koine Greek. Occasionally, the best word translation cannot be found and these words are transliterated letter by letter. Four well known transliterations are *Christ*, *baptism*, *angel*, and *apostle*. The meaning is then preserved more accurately through context and a dictionary. The Aionian Bible un-translates and instead transliterates eleven additional Aionian Glossary words to help us better understand God's love for individuals and all mankind, and the nature of afterlife destinies.

The first three words are *aiōn*, *aiōnios*, and *aiōdios*, typically translated as *eternal* and also *world* or *eon*. The Aionian Bible is named after an alternative spelling of *aiōnios*. Consider that researchers question if *aiōn* and *aiōnios* actually mean *eternal*. Translating *aiōn* as *eternal* in Matthew 28:20 makes no sense, as all agree. The Greek word for *eternal* is *aiōdios*, used in Romans 1:20 about God and in Jude 6 about demon imprisonment. Yet what about *aiōnios* in John 3:16? Certainly we do not question whether salvation is eternal! However, *aiōnios* means something much more wonderful than infinite time! Ancient Greeks used *aiōn* to mean *eon* or *age*. They also used the adjective *aiōnios* to mean *entirety*, such as *complete* or even *consummate*, but never infinite time. Read Dr. Heleen Keizer and Ramelli and Konstan for proofs. So *aiōnios* is the perfect description of God's Word which has *everything* we need for life and godliness! And the *aiōnios* life promised in John 3:16 is not simply a ticket to eternal life in the future, but the invitation through faith to the *consummate* life beginning now!

The next seven words are *Sheol*, *Hadēs*, *Geenna*, *Tartaroō*, *Abyssos*, and *Limnē Pyr*. These words are often translated as *Hell*, the place of eternal punishment. However, *Hell* is ill-defined when compared with the Hebrew and Greek. For example, *Sheol* is the abode of deceased believers and unbelievers and should never be translated as *Hell*. *Hadēs* is a temporary place of punishment, Revelation 20:13-14. *Geenna* is the Valley of Hinnom, Jerusalem's refuse dump, a temporal judgment for sin. *Tartaroō* is a prison for demons, mentioned once in 2 Peter 2:4. *Abyssos* is a temporary prison for the Beast and Satan. Translators are also inconsistent because *Hell* is used by the King James Version 54 times, the New International Version 14 times, and the World English Bible zero times. Finally, *Limnē Pyr* is the Lake of Fire, yet Matthew 25:41 explains that these fires are prepared for the Devil and his angels. So there is reason to review our conclusions about the destinies of redeemed mankind and fallen angels.

The eleventh word, *eleēsē*, reveals the grand conclusion of grace in Romans 11:32. Take the time to understand these eleven words. The original translation is unaltered and a note is added to 64 Old Testament and 200 New Testament verses. To help parallel study and Strong's Concordance use, apocryphal text is removed and most variant verse numbering is mapped to the English standard. We thank our sources at eBible.org, Crosswire.org, unbound.Biola.edu, Bible4u.net, and NHEB.net. The Aionian Bible is copyrighted with creativecommons.org/licenses/by-nd/4.0, allowing 100% freedom to copy and print, if respecting source copyrights. Check the Reader's Guide and read online at AionianBible.org, with Android, and TOR network. Why purple? King Jesus' Word is royal... and purple is the color of royalty!

વિષયવસ્તુ

નવી ટેસ્ટામેન્ટ

મથિ:	11
માર્ક:	69
લૂક:	105
યોહન:	166
પ્રેરિતા:	214
રોમિણ:	277
૧ કરિન્થિન:	303
૨ કરિન્થિન:	328
ગાલાતિન:	344
ઇફ્રિષિણ:	353
ફિલિપિન:	361
કલસિન:	367
૧ થિષલનીકિન:	373
૨ થિષલનીકિન:	379
૧ તીમથિય:	382
૨ તીમથિય:	389
તીત:	394
ફિલોમોન:	397
ઇબ્રિણ:	399
યાકૂબ:	417
૧ પિતર:	423
૨ પિતર:	430
૧ યોહન:	434
૨ યોહન:	441
૩ યોહન:	442
ચિહ્ન:	443
પ્રકાશિતં	445

જોડાણો

રીડરની માર્ગદર્શિકા

ગ્લોસરી

નકશા

નિયતિ

ચિત્રો, Doré

नवी टेस्टामेन्ट



तदा यीशुश्चकथयत्, हे पितरेतान् क्षमस्व यत अते यत् कर्म्म कुर्वन्ति तन् न विद्मः;
पश्चात्ते गुटिकापातं कृत्वा तस्य वस्त्राणि विभज्य जगुः
लूकः 23:34

મથિ:

1 ઇબ્રાહીમ: સન્તાનો દાયૂદ્ તસ્ય સન્તાનો યીશુખ્રીષ્ટસ્તસ્ય પૂર્વપુરુષવંશશ્રેણી | 2 ઇબ્રાહીમ: પુત્ર ઇસ્હાક્ તસ્ય પુત્રો યાકૂબ્ તસ્ય પુત્રો યિહૂદાસ્તસ્ય ભ્રાતરશ્ચ | 3 તસ્માદ્ યિહૂદાતસ્તામરો ગર્ભે પેરસેરહૌ જજ્ઞાતે, તસ્ય પેરસ: પુત્રો હિથ્રોણ્ તસ્ય પુત્રો ડરામ્ | 4 તસ્ય પુત્રો ડમ્મીનાદબ્ તસ્ય પુત્રો નહશોન્ તસ્ય પુત્ર: સલ્મોન્ | 5 તસ્માદ્ રાહબો ગર્ભે બોયમ્ જજ્ઞે, તસ્માદ્ રૂતો ગર્ભે ઓબેદ્ જજ્ઞે, તસ્ય પુત્રો યિશય: | 6 તસ્ય પુત્રો દાયૂદ્ રાજ: તસ્માદ્ મૃતોરિયસ્ય જાયાયાં સુલેમાન્ જજ્ઞે | 7 તસ્ય પુત્રો રિહબિયામ્, તસ્ય પુત્રોડબિય:, તસ્ય પુત્ર આસા: | 8 તસ્ય સુતો યિહોશાફ્ટ્ તસ્ય સુતો યિહોરામ તસ્ય સુત ઉષિય: | 9 તસ્ય સુતો યોથમ્ તસ્ય સુત આહમ્ તસ્ય સુતો હિષ્કિય: | 10 તસ્ય સુતો મિનશિ:, તસ્ય સુત આમોન્ તસ્ય સુતો યોશિય: | 11 બાબિલ્નગરે પ્રવસનાત્ પૂર્વ્વ સ યોશિયો યિખનિયં તસ્ય ભ્રાતૃશ્ચ જનયામાસ | 12 તતો બાબિલિ પ્રવસનકાલે યિખનિય: શલ્તીયેલં જનયામાસ, તસ્ય સુત: સિરુબ્બાવિલ્ | 13 તસ્ય સુતો ડબોહુદ્ તસ્ય સુત ઇલીયાકીમ્ તસ્ય સુતોડસોર્ | 14 અસોર: સુત: સાદોફ્ તસ્ય સુત આખીમ્ તસ્ય સુત ઇલીહૂદ્ | 15 તસ્ય સુત ઇલિયાસર્ તસ્ય સુતો મત્તન્ | 16 તસ્ય સુતો યાકૂબ્ તસ્ય સુતો યૂષફ્ તસ્ય જાયા મરિયમ્; તસ્ય ગર્ભે યીશુરજનિ, તમેવ ખ્રીષ્ટમ્ (અર્થાદ્ અભિષિક્તં) વદન્તિ | 17 ઇત્યમ્ ઇબ્રાહીમો દાયૂદ્ યાવત્ સાકલ્યેન ચતુર્દશપુરુષા:; આ દાયૂદ્: કાલાદ્ બાબિલિ પ્રવસનકાલં યાવત્ ચતુર્દશપુરુષા ભવન્તિ | બાબિલિ પ્રવાસનકાલાત્ ખ્રીષ્ટસ્ય કાલં યાવત્ ચતુર્દશપુરુષા ભવન્તિ | 18 યીશુખ્રીષ્ટસ્ય જન્મ કથ્યતે | મરિયમ્ નામિકા કન્યા યૂષફ્ વાગ્દતાસીત્, તદા તયો: સજ્ઞમાત્ પ્રાફ્ સા કન્યા પવિત્રેણાત્મના ગર્ભવતી બભૂવ | 19 તત્ર તસ્યા: પતિ યૂષફ્ સૌજન્યાત્ તસ્યા: કલજ્ઞં પ્રકાશયિતુમ્ અનિચ્છન્ ગોપનેને તાં પારિત્યક્તું મનશ્ચક્રે | 20 સ તથૈવ ભાવયતિ, તદાનીં પરમેશ્વરસ્ય દૂત: સ્વાપ્ને તં દર્શનં દન્વા વ્યાજહાર, હે દાયૂદ્: સન્તાન યૂષફ્ ત્વં નિજાં જાયાં મરિયમમ્ આદાતું મા ભૈષી: | 21 યતસ્તસ્યા ગર્ભ: પવિત્રાદાત્મનોડભવત્, સા ચ પુત્રં પ્રસવિષ્યતે, તદા ત્વં તસ્ય નામ યીશુમ્ (અર્થાત્ ત્રાતારં) કરીષ્યસે, યસ્માત્ સ નિજમનુજાન્ તેષાં કલુષેભ્ય ઉદ્ધરિષ્યતિ | 22 ઇત્યં

सति, पश्य गर्भवती कन्या तनयं प्रसविष्यते | एम्मानूयेल् तदीयञ्च नामधेयं
 भविष्यति | | एम्मानूयेल् अस्माकं सङ्गीश्वरइत्यर्थः | 23 एति यद् वचनं
 पुर्व्वं भविष्यद्भक्त्रा एश्वरः कथायामास, तत् तदानीं सिद्धमभवत् | 24
 अनन्तरं यूषङ् निद्रातो जागरित उत्थाय परमेश्वरीयदूतस्य निदेशानुसारेण
 निजं जायां जग्राह, 25 किन्तु यावत् सा निजं प्रथमसुतं अ सुषुप्ते, तावत्
 तां नोपागच्छत्, ततः सुतस्य नाम यीशुं यके |

2 अनन्तरं डेरोद् संज्ञके राज्ञि राज्यं शासति यिडूदीयदेशस्य बैत्लेडमि
 नगरे यीशौ जातवति य, कतिपया ज्योतिर्व्वुदः पूर्व्वस्या द्दिशो
 यिडूशालमनगरं समेत्य कथयमासुः, 2 यो यिडूदीयानां राजा जातवान्,
 स कुत्रास्ते? वयं पूर्व्वस्यां द्दिशि तिष्ठन्तस्तदीयां तारकाम् अपश्याम
 तस्मात् तं प्राणन्तुम् अगमाम | 3 तदा डेरोद् राजा कथाभेतां
 निशम्य यिडूशालमनगरस्थितैः सर्व्वमानवैः सार्द्धम् उद्विज्य 4 सर्व्वान्
 प्रधानयाजकान् अध्यापकांश्च समाडूयानीय पप्रच्छ, श्रीष्टः कुत्र जनिष्यते?
 5 तदा ते कथयामासुः, यिडूदीयदेशस्य बैत्लेडमि नगरे, यतो भविष्यद्वादिना
 एत्थं लिखितमास्ते, 6 सर्व्वान्भ्यो राजधानीभ्यो यिडूदीयस्य नीवृतः | डे
 यीडूदीयदेशस्ये बैत्लेडम् त्वं न यावरा | एसायेलीयलोकान् मे यतो यः
 पालयिष्यति | तादृगेको मडाराजस्त्वन्मध्य उद्भविष्यती | | 7 तदानीं डेरोद्
 राजा तान् ज्योतिर्व्विदो गोपनम् आडूय सा तारका कदा दृष्टाभवत्, तद्
 विनिश्चयामास | 8 अपरं तान् बैत्लेडमं प्रडीत्य गदितवान्, यूयं यात,
 यत्नात् तं शिशुम् अन्विष्य तद्दुदेशे प्राप्ते मह्यं वार्त्तां दास्यथ, ततो मयापि
 गत्वा स प्राणंस्यते | 9 तदानीं राजा अेतादृशीम् आज्ञां प्राप्य ते प्रतस्थिरे,
 ततः पूर्व्वस्यां द्दिशि स्थितैस्ते र्या तारका दृष्टा सा तारका तेषामग्रे गत्वा यत्र
 स्थाने शिशूरास्ते, तस्य स्थानस्योपरि स्थगिता तस्यौ | 10 तद् दृष्ट्वा ते
 मडानन्दिता बभूवुः, 11 ततो गेडमध्य प्रविश्य तस्य मात्रा मरियमा सार्द्धं तं
 शिशुं निरीक्ष्य दएडवद् भूत्वा प्राणमुः, अपरं स्वेषां धनसम्पत्तिं भोगयित्वा
 सुवार्णं कुन्दुं गन्धरमञ्च तस्मै दर्शनीयं दत्तवन्तः | 12 पश्चाद् डेरोद्
 राजस्य समीपं पुनरपि गन्तुं स्वप्न एश्वरेण निषिद्धाः सन्तो डन्येन पथा ते
 निजदेशं प्रति प्रतस्थिरे | 13 अनन्तरं तेषु गतवत्सु परमेश्वरस्य दूतो
 यूषङ् स्वप्ने दर्शनं दत्वा जगाह, त्वम् उत्थाय शिशुं तन्मातरञ्च गृहीत्वा

भिसर्देशं पलायस्व, अपरं यावदहं तुभ्यं वार्तां न कथयिष्यामि, तावत्
 तत्रैव निवस, यतो राजा डेरोद् शिशुं नाशयितुं भृगयिष्यते | 14 तदानीं
 यूषङ् उत्थाय रजन्यां शिशुं तन्मातरञ्च गृहीत्वा भिसर्देशं प्रति प्रतस्थे, 15
 गत्वा य डेरोदो नृपते भ्रंशपथ्यन्तं तत्र देशे न्युवास, तेन भिसर्देशाहं पुत्रं
 स्वकीयं समुपाडूयम् | यदेतद्वयनम् ईश्वरेण भविष्यद्वादिना कथितं तत्
 सङ्गलभभूत् | 16 अनन्तरं डेरोद् ज्योतिर्विद्विरात्मानं प्रवञ्चितं विज्ञाय भृशं
 युकोप; अपरं ज्योतिर्विद्विभ्यस्तेन विनिश्चितं यद् दिनं तद्विनाद् गणयित्वा
 द्वितीयवत्सरं प्रविष्टा यावन्तो बालका अस्मिन् भैतलेडमनगरे तत्सीममध्ये
 यासन्, लोकान् प्रहित्य तान् सर्वान् घातयामास | 17 अतः अनेकस्य
 विलापस्य निनादः कन्दनस्य य | शोकेन कृतशब्दश्च रामायां संनिशम्यते |
 स्वबालगण्डोतोर्वै राडेल् नारी तु रोदिनी | न मन्यते प्रबोधन्तु यतस्ते
 नैव मन्ति हि | | 18 यदेतद् वयनं यिरीमियनामकभविष्यद्वादिना कथितं
 तत् तदानीं सङ्गलम् अभूत् | 19 तदनन्तरं डेरेदि राजनि मृते परमेश्वरस्य
 दूतो भिसर्देशे स्वप्ने दर्शनं दत्त्वा यूषङ् कथितवान् 20 त्वम् उत्थाय शिशुं
 तन्मातरञ्च गृहीत्वा पुनरपीसायेलो देशं याही, ये जनाः शिशुं नाशयितुम्
 अभृगयन्त, ते मृतवन्तः | 21 तदानीं स उत्थाय शिशुं तन्मातरञ्च गृह्णन्
 एसायेल्लेशम् आजगाम | 22 किन्तु यिडूदीयदेशे अर्षिलायनाम राजकुमारो
 निजपितु डेरोदः पदं प्राप्य राजत्वं करोतीति निशम्य तत् स्थानं यातुं
 शङ्कितवान्, पश्चात् स्वप्न ईश्वरात् प्रबोधं प्राप्य गालील्लेशस्य प्रदेशैकं
 प्रस्थाप्य नासरन्नाम नगरं गत्वा तत्र न्युषितवान्, 23 तेन तं नासरतीयं
 कथयिष्यन्ति, यदेतद्वाक्यं भविष्यद्वादिभिरुक्तं तत् सङ्गलभभवत् |

3 तदानीं योहन्नामा मज्जयिता यिडूदीयदेशस्य प्रान्तरम् उपस्थाय
 प्रचारयन् कथयामास, 2 मनांसि परावर्तयत, स्वर्गीयराजत्वं
 समीपमागतम् | 3 परमेशस्य पन्थानं परिष्कुरुत सर्वतः | तस्य
 राजपथांश्चैव समीकुरुत सर्वथा | एत्येतत् प्रान्तरे वाक्यं वदतः कस्ययिद्
 रवः | | 4 अतद्वयनं यिशयियभविष्यद्वादिना योहनमुद्दिश्य भाषितम् |
 योहनो वसनं मडाङ्गरोमञ्च तस्य कटौ यर्मकटिबन्धनं; स य शूकडीटान् मधु
 य भुक्तवान् | 5 तदानीं यिडूशालमनगरनिवासिनः सर्वे यिडूदिदेशीया
 यर्दन्तटिन्या उभयतटस्थाश्च मानवा बहिरागत्य तस्य समीपे 6 स्वीयं

સ્વીયં દુરિતમ્ અઙ્ગીકૃત્ય તસ્યાં યદ્દનિ તેન મજ્જિજતા બભૂવુઃ | 7 અપરં
બહૂન્ ફિરુશિનઃ સિદ્ધકિનશ્ચ મનુજાન્ મંકતું સ્વસમીપમ્ આગચ્છતો વિલોક્ય
સ તાન્ અભિદધૌ, રે રે ભુજગવંશા આગામીનઃ કોપાત્ પલાયિતું યુષ્માન્
કશ્ચેતિતવાન્? 8 મનઃપરાવર્તનસ્ય સમુચિતં ફલં ફલત | 9 કિન્ત્વસ્માકં
તાત ઇબ્રાહીમ્ અસ્તીતિ સ્વેષુ મનઃસુ ચીન્તયન્તો મા વ્યાહરત | યતો
યુષ્માન્ અહં વદામિ, ઇશ્વર એતેભ્યઃ પાષાણેભ્ય ઇબ્રાહીમઃ સન્તાનાન્
ઉત્પાદયિતું શકનોતિ | 10 અપરં પાદપાનાં મૂલે કુઠાર ઇદાનીમપિ લગન્
આસ્તે, તસ્માદ્ યસ્મિન્ પાદપે ઉત્તમં ફલં ન ભવતિ, સ કૃત્તો મધ્યેડગ્નિં
નિક્ષેપ્યતે | 11 અપરમ્ અહં મનઃપરાવર્તનસૂચકેન મજ્જજનેન યુષ્માન્
મજ્જયામીતિ સત્યં, કિન્તુ મમ પશ્ચાદ્ ય આગચ્છતિ, સ મત્તોપિ મહાન્,
અહં તદીયોપાનહૌ વોદુમપિ નહિ યોગ્યોસ્મિ, સ યુષ્માન્ વહ્નિરૂપે પવિત્ર
આત્મનિ સંમજ્જયિષ્યતિ | 12 તસ્ય કારે સૂર્પ આસ્તે, સ સ્વીયશસ્યાનિ
સમ્યક્ પ્રસ્ફુટ્ય નિજાન્ સકલગોધૂમાન્ સંગૃહ્ય ભાણ્ડાગારે સ્થાપયિષ્યતિ,
કિન્તુ સર્વાણિ વુષાણ્યનિર્વાણવહ્નિના દાહયિષ્યતિ | 13 અનન્તરં યીશુ
ચોહના મજ્જિજતો ભવિતું ગાલીલ્પ્રદેશાદ્ યદ્દનિ તસ્ય સમીપમ્ આજગામ |
14 કિન્તુ ચોહન્ તં નિષિધ્ય બભાષે, ત્વં કિં મમ સમીપમ્ આગચ્છસિ?
વરં ત્વયા મજ્જનં મમ પ્રયોજનમ્ આસ્તે | 15 તદાનીં યીશુઃ પ્રત્યવોચતઃ
ઇદાનીમ્ અનુમન્યસ્વ, યત ઇત્યં સર્વધર્મસાધનમ્ અસ્માકં કર્તવ્યં,
તતઃ સોડન્વમન્યત | 16 અનન્તરં યીશુરમ્મસિ મજ્જિજતુઃ સન્ તત્ક્ષણાત્
તોયમધ્યાદ્ ઉત્થાય જગામ, તદા જીમૂતદ્વારે મુક્તે જાતે, સ ઇશ્વરસ્યાત્માનં
કપોતવદ્ અવરુહ્ય સ્વોપચ્યાગચ્છન્તં વીક્ષાઞ્ચક્રે | 17 અપરમ્ એષ મમ
પ્રિયઃ પુત્ર એતસ્મિન્નેવ મમ મહાસન્તોષ એતાદૃશી વ્યોમજા વાગ્ બભૂવ |

4 તતઃ પરં યીશુઃ પ્રતારકેણ પરીક્ષિતો ભવિતુમ્ આત્મના પ્રાન્તરમ્
આકૃષ્ટઃ 2 સન્ ચત્વારિંશદહોરાત્રાન્ અનાહારસ્તિષ્ઠન્ ક્ષુધિતો બભૂવ | 3
તદાનીં પરીક્ષિતા તત્સમીપમ્ આગત્ય વ્યાહતવાન્, યદિ ત્વમીશ્વરાત્મજો
ભવેસ્તર્હ્યાજ્ઞયા પાષાણાનેતાન્ પૂપાન્ વિધેહિ | 4 તતઃ સ પ્રત્યબ્રવીત્, ઇત્યં
લિખિતમાસ્તે, "મનુજઃ કેવલપૂપેન ન જીવિષ્યતિ, કિન્ત્વીશ્વરસ્ય વદનાદ્
યાનિ યાનિ વયાંસિ નિઃસરન્તિ તૈરેવ જીવિષ્યતિ | " 5 તદા પ્રતારકસ્તં
પુણ્યનગરં નીત્વા મન્દિરસ્ય ચૂડોપરિ નિધાય ગદિતવાન્, 6 ત્વં યદિશ્વરસ્ય

તનયો ભવેસ્તર્હીતોડધઃ પત, યત ઇત્થં લિખિતમાસ્તે, આદેક્ષ્યતિ નિજાન્
 દૂતાન્ રક્ષિતું ત્વાં પરમેશ્વરઃ | યથા સર્વેષુ માર્ગેષુ ત્વદીયચરણદ્વયે | ન લગેત્
 પ્રસ્તરાઘાતસ્ત્વાં ધરિષ્યન્તિ તે કરૈઃ | | 7 તદાનીં યીશુસ્તસ્મૈ કથિતવાન્
 એતદપિ લિખિતમાસ્તે, "ત્વં નિજપ્રભું પરમેશ્વરં મા પરીક્ષસ્વ | " 8 અનન્તરં
 પ્રતારકઃ પુનરપિ તમ્ અત્યુઞ્ઞધરાધરોપરિ નીત્વા જગતઃ સકલરાજ્યાનિ
 તદૈશ્વર્ય્યાણિ ચ દર્શયાશ્રકાર કથયાઞ્ઞકાર ચ, 9 યદિ ત્વં દાણ્ડવદ્ ભવન્
 માં પ્રણમેસ્તર્હાહમ્ એતાનિ તુભ્યં પ્રદાસ્યામિ | 10 તદાનીં યીશુસ્તમવોચત્,
 દૂરીભવ પ્રતારક, લિખિતમિદમ્ આસ્તે, "ત્વયા નિજઃ પ્રભુઃ પરમેશ્વરઃ
 પ્રણમ્યઃ કેવલઃ સ સેવ્યશ્ર | " 11 તતઃ પ્રતારકેણ સ પર્ય્યાજિ, તદા
 સ્વર્ગીયદૂતૈરાગત્ય સ સિષેવે | 12 તદનન્તરં યોહન્ કારાયાં બબન્ધે, તદ્વાર્તા
 નિશમ્ય યીશુના ગાલીલ્ પ્રાસ્થીયત | 13 તતઃ પરં સ નાસરન્નગરં વિહાય
 જલધેસ્તટે સિબૂલૂનાપ્તાલી એતયોરુવભયોઃ પ્રદેશયોઃ સીમ્નોર્મધ્યવર્તી યઃ
 કફૂર્નાહૂમ્ તન્નગરમ્ ઇત્વા ન્યવસત્ | 14 તસ્માત્, અન્યાદેશીયગાલીલિ
 યદ્ન્યારેડબ્ધિરોધસિ | નપ્તાલિસિબૂલૂન્દેશૌ યત્ર સ્થાને સ્થિતૌ પુરા | 15
 તત્રત્યા મનુજા યે યે પર્ય્યામ્યન્ તમિસ્રકે | તૈર્જનૈર્બૃહદાલોકઃ પરિદર્શિષ્યતે
 તદા | અવસન્ યે જના દેશે મૃત્યુચ્છાયાસ્વરૂપકે | તેષામુપરિ લોકાનામાલોકઃ
 સંપ્રકાશિતઃ | | 16 યદેતદ્વચનં યિશયિયભવિષ્યદ્વાદિના પ્રોક્તં, તત્ તદા
 સફૂલમ્ અભૂત | 17 અનન્તરં યીશુઃ સુસંવાદં પ્રચારયન્ એતાં કથાં કથયિતુમ્
 આરેભે, મનાંસિ પરાવર્તયત, સ્વર્ગીયરાજત્વં સવિધમભવત્ | 18 તતઃ પરં
 યીશુ ગાલીલો જલધેસ્તટેન ગચ્છન્ ગચ્છન્ આન્દ્રિયસ્તસ્ય ભ્રાતા શિમોન્
 અર્થતો યં પિતરં વદન્તિ એતાવુભૌ જલધૌ જાલં ક્ષિપન્તૌ દદર્શ, યતસ્તૌ
 મીનધારિણાવાસ્તામ્ | 19 તદા સ તાવાહૂય વ્યાજહાર, યુવાં મમ પશ્ચાદ્
 આગચ્છતં, યુવામહં મનુજધારિણૌ કરિષ્યામિ | 20 તેનેવ તૌ જાલં વિહાય
 તસ્ય પશ્ચાત્ આગચ્છતામ્ | 21 અનન્તરં તસ્માત્ સ્થાનાત્ પ્રજન્ પ્રજન્
 સિવદિયસ્ય સુતૌ યાકૂબ્ યોહન્નામાનીં દ્વૌ સહજૌ તાતેન સાર્દ્ધં નૌકોપરિ
 જાલસ્ય જીર્ણોદ્ધારં કુર્વન્તૌ વીક્ષ્ય તાવાહૂતવાન્ | 22 તત્ક્ષણાત્ તૌ નાવં
 સ્વતાતઞ્ચ વિહાય તસ્ય પશ્ચાદ્ભિનૌ બભૂવતુઃ | 23 અનન્તરં ભજનભવને
 સમુપદિશન્ રાજ્યસ્ય સુસંવાદં પ્રચારયન્ મનુજાનાં સર્વપ્રકારાન્ રોગાન્
 સર્વપ્રકારપીડાશ્ચ શમયન્ યીશુઃ કૃત્સ્નં ગાલીલ્દેશં ભ્રમિતુમ્ આરભત |

24 तेन कृत्स्नसुरियादेशस्य मध्यं तस्य यशो व्याप्नोत्, अपरं ભૂતગ્રસ્તા
 અપસ્મારગીર્ણઃ પક્ષાઘાતિપ્રભૃતયશ્ચ યાવન્તો મનુજા નાનાવિધવ્યાધિભિઃ
 ક્લિષ્ટા આસન્, તેષુ સર્વેષુ તસ્ય સમીપમ્ આનીતેષુ સ તાન્ સ્વસ્થાન્
 ચકાર | 25 એતેન ગાલીલ્-દિકાપનિ-ચિરુશાલમ્-ચિહ્નદીયદેશેભ્યો યદ્નઃ
 પારાઞ્ચ બહવો મનુજાસ્તસ્ય પશ્ચાદ્ આગચ્છન્ |

5 અનન્તરં સ જનનિવહં નિરીક્ષ્ય ભૂધરોપરિ વ્રજિત્વા સમુપવિવેશ | 2
 તદાનીં શિષ્યેષુ તસ્ય સમીપમાગતેષુ તેન તેભ્ય ઓષા કથા કથ્યાઞ્ચકે | 3
 અભિમાનહીના જના ધન્યાઃ, યતસ્તે સ્વર્ગીયરાજ્યમ્ અધિકરિષ્યન્તિ | 4
 ખિધમાના મનુજા ધન્યાઃ, યસ્માત્ તે સાન્વનાં પ્રાપ્સન્તિ | 5 નમ્રા માનવાશ્ચ
 ધન્યાઃ, યસ્માત્ તે મેદિનીમ્ અધિકરિષ્યન્તિ | 6 ધર્મ્માય બુભુક્ષિતાઃ
 તૃષાર્તાશ્ચ મનુજા ધન્યાઃ, યસ્માત્ તે પરિતપ્સ્યન્તિ | 7 કૃપાલવો માનવા
 ધન્યાઃ, યસ્માત્ તે કૃપાં પ્રાપ્સ્યન્તિ | 8 નિર્મલહૃદયા મનુજાશ્ચ ધન્યાઃ,
 યસ્માત્ ત ઈશ્વરં દ્રક્ષ્યન્તિ | 9 મેલચિતારો માનવા ધન્યાઃ, યસ્માત્ ત
 ઈશ્વરસ્ય સન્તાનત્વેન વિખ્યાસ્યન્તિ | 10 ધર્મકારણાત્ તાડિતા મનુજા
 ધન્યા, યસ્માત્ સ્વર્ગીયરાજ્યે તેષામધિકરો વિધતે | 11 યદા મનુજા મમ
 નામકૃતે યુષ્માન્ નિન્દન્તિ તાડયન્તિ મૃષા નાનાદુર્વ્યાક્યાનિ વદન્તિ ચ,
 તદા યુયં ધન્યાઃ | 12 તદા આનન્દત, તથા ભૃશં હ્લાદધ્વઞ્ચ, યતઃ સ્વર્ગો
 ભૂયાંસિ ફલાનિ લપ્સ્યધ્વે; તે યુષ્માકં પુરાતનાન્ ભવિષ્યદ્વાદિનોડપિ તાદૃગ્
 અતાડયન્ | 13 યુયં મેદિન્યાં લવાણરૂપાઃ, કિન્તુ યદિ લવાણસ્ય લવાણત્વમ્
 અપયાતિ, તર્હિ તત્ કેન પ્રકારેણ સ્વાદુયુક્તં ભવિષ્યતિ? તત્ કસ્યાપિ
 કાર્યસ્યાયોગ્યત્વાત્ કેવલં બહિઃ પ્રક્ષેપ્તું નરાણાં પદતલેન દલચિતુઞ્ચ યોગ્યં
 ભવતિ | 14 યૂયં જગતિ દીપ્તિરૂપાઃ, ભૂધરોપરિ સ્થિતં નગરં ગુપ્તં ભવિતું
 નહિ શક્સ્યતિ | 15 અપરં મનુજાઃ પ્રદીપાન્ પ્રજ્વાલ્ય દ્રોણાઘો ન સ્થાપયન્તિ,
 કિન્તુ દીપાધારોપર્યેવ સ્થાપયન્તિ, તેન તે દીપા ગેહસ્થિતાન્ સકલાન્
 પ્રકાશયન્તિ | 16 યેન માનવા યુષ્માકં સત્કર્માણિ વિલોક્ય યુષ્માકં સ્વર્ગસ્થં
 પિતરં ધન્યં વદન્તિ, તેષાં સમક્ષં યુષ્માકં દીપ્તિસ્તાદૃક્ પ્રકાશતામ્ | 17 અહં
 વ્યવસ્થાં ભવિષ્યદ્વાક્યઞ્ચ લોપ્તુમ્ આગતવાન્, ઇત્યં માનુભવત, તે દ્વે લોપ્તું
 નાગતવાન્, કિન્તુ સફલે કર્તુમ્ આગતોસ્મિ | 18 અપરં યુષ્માન્ અહં તથ્યં
 વદામિ યાવત્ વ્યોમમેદિન્યો ધ્વંસો ન ભવિષ્યતિ, તાવત્ સર્વોસ્મિન્ સફલે

न जाते व्यवस्थाया अेका मात्रा भिन्दुरेकोपि वा न लोभ्यते | 19 तस्मात्
 यो जन अेतासाम् आङ्गानाम् अतिक्षुद्राम् अेकाङ्गामपी लंघते मनुजांश्च
 तथैव शिक्षयति, स स्वर्गीयराज्ये सर्वोभ्यः क्षुद्रत्वेन विभ्यास्यते, किन्तु
 यो जनस्तां पालयति, तथैव शिक्षयति य, स स्वर्गीयराज्ये प्रधानत्वेन
 विभ्यास्यते | 20 अपरं युष्मान् अहं वदामि, अध्यापकङ्किंशुमानवानां
 धर्मानुष्ठानात् युष्माकं धर्मानुष्ठाने नोत्तमे जाते यूयम् एश्वरीयराज्यं प्रवेष्टुं
 न शक्यथ | 21 अपरञ्च त्वं नरं मा वधीः, यस्मात् यो नरं हन्ति, स
 विचारसभायां एङ्गार्हो भविष्यति, पूर्वकालीनजनेभ्य एति कथितमासीत्,
 युष्माभिरश्रावि | 22 किन्त्वहं युष्मान् वदामि, यः कश्चित् कारणां विना
 निजभ्रात्रे कुप्यति, स विचारसभायां एङ्गार्हो भविष्यति; यः कश्चिच्च
 स्वीयसङ्गं निर्वर्द्धं वदति, स महासभायां एङ्गार्हो भविष्यति; पुनश्च
 त्वं मूढ एति वाक्यं यद्वि कश्चित् स्वीयभ्रातरं वक्ति, तर्हि नरकाग्नौ स
 एङ्गार्हो भविष्यति | (Geenna g1067) 23 अतो वेधाः समीपं निजनैवेधे
 समानीतेऽपि निजभ्रातरं प्रति कस्माच्चित् कारणात् त्वं यद्वि दोषी विधसे,
 तदानीं तव तस्य स्मृति र्जायते य, 24 तर्हि तस्या वेधाः समीपे निजनैवेधं
 निधाय तदैव गत्वा पूर्व्य तेन सार्द्धं मिल, पश्चात् आगत्य निजनैवेधं
 निवेदय | 25 अन्यञ्च यावत् विवादिना सार्द्धं वर्त्मनि तिष्ठसि, तावत्
 तेन सार्द्धं भेलनं कुरु; नो येत् विवादी विचारयितुः समीपे त्वां समर्पयति
 विचारयिता य रक्षिणः सन्निधौ समर्पयति तदा त्वं कारायां अध्येथाः |
 26 तर्हि त्वामहं तथ्यं ब्रवीमि, शेषकपर्देऽपि न परिशोधिते तस्मात्
 स्थानात् कदापि अडिरागन्तुं न शक्यसि | 27 अपरं त्वं मा व्यभियर,
 यदेतद् वयनं पूर्वकालीनलोकेभ्यः कथितमासीत्, तद् यूयं श्रुतवन्तः; 28
 किन्त्वहं युष्मान् वदामि, यद्वि कश्चित् कामतः काञ्चन योषितं पश्यति, तर्हि
 स मनसा तदैव व्यभियरितवान् | 29 तस्मात् तव दक्षिणां नेत्रं यद्वि त्वां
 आधते, तर्हि तन्नेत्रम् उत्पाट्य दूरे निक्षिप, यस्मात् तव सर्व्ववपुषो नरके
 निक्षेपात् तवैकाङ्गस्य नाशो वरं | (Geenna g1067) 30 यद्वा तव दक्षिणः
 करो यद्वि त्वां आधते, तर्हि तं करं छित्वा दूरे निक्षिप, यतः सर्व्ववपुषो
 नरके निक्षेपात् अेकाङ्गस्य नाशो वरं | (Geenna g1067) 31 उक्तमास्ते,
 यद्वि कश्चिन् निजजायां परित्यक्तुम् एच्छति, तर्हि स तस्यै त्यागपत्रं

દદાતુ| 32 કિન્ત્વહં યુષ્માન્ વ્યાહરામિ, વ્યભિચારદોષે ન જાતે યદિ કશ્ચિન્
 નિજજાયાં પરિત્યજતિ, તર્હિ સ તાં વ્યભિચારયતિ; યશ્ચ તાં ત્યક્તાં સ્ત્રિયં
 વિવહતિ, સોપિ વ્યભિચરતિ| 33 પુનશ્ચ ત્વં મૃષા શપથમ્ ન કુર્વન્
 ઇશ્વરાય નિજશપથં પાલય, પૂર્વકાલીનલોકેભ્યો યૈષા કથા કથિતા, તામપિ
 યૂયં શ્રુતવન્તઃ| 34 કિન્ત્વહં યુષ્માન્ વદામિ, કમપિ શપથં મા કાર્ષ્ટ, અર્થતઃ
 સ્વર્ગનામ્ના ન, યતઃ સ ઇશ્વરસ્ય સિંહાસનં; 35 પૃથિવ્યા નામ્નાપિ ન,
 યતઃ સા તસ્ય પાદપીઠં; ચિરૂશાલમો નામ્નાપિ ન, યતઃ સા મહારાજસ્ય
 પુરી; 36 નિજશિરોનામ્નાપિ ન, યસ્માત્ તસ્યૈકં કચમપિ સિતમ્ અસિતં
 વા કર્તું ત્વયા ન શક્યતે| 37 અપરં યૂયં સંલાપસમયે કેવલં ભવતીતિ
 ન ભવતીતિ ચ વદત યત ઇતોઽધિકં યત્ તત્ પાપાત્મનો જાયતે| 38
 અપરં લોચનસ્ય વિનિમયેન લોચનં દન્તસ્ય વિનિમયેન દન્તઃ પૂર્વકતમિદં
 વચનઞ્ચ યુષ્માભિરશ્રૂયત| 39 કિન્ત્વહં યુષ્માન્ વદામિ યૂયં હિંસકં નરં મા
 વ્યાઘાતયત| કિન્તુ કેનચિત્ તવ દક્ષિણકપોલે ચપેટાઘાતે કૃતે તં પ્રતિ વામં
 કપોલઞ્ચ વ્યાઘોટય| 40 અપરં કેનચિત્ ત્વયા સાર્દ્ધં વિવાદં કૃત્વા તવ
 પરિઘેયવસને જિઘૃતિતે તસ્માયુત્તરીયવસનમપિ દેહિ| 41 યદિ કશ્ચિત્ ત્વાં
 કોશમેકં નચનાર્થં અન્યાયતો ધરતિ, તદા તેન સાર્દ્ધં કોશદ્વયં યાહિ| 42
 યશ્ચ માનવસ્ત્વાં યાયતે, તસ્મૈ દેહિ, યદિ કશ્ચિત્ તુભ્યં ધારયિતુમ્ ઇચ્છતિ,
 તર્હિ તં પ્રતિ પરાંમુખો મા ભૂઃ| 43 નિજસમીપવસિનિ પ્રેમ કુરુ, કિન્તુ શત્રું
 પ્રતિ દ્વેષં કુરુ, યદેતત્ પુરોક્તં વચનં એતદપિ યૂયં શ્રુતવન્તઃ| 44 કિન્ત્વહં
 યુષ્માન્ વદામિ, યૂયં રિપુવ્વપિ પ્રેમ કુરુત, યે ચ યુષ્માન્ શપન્તે, તાન,
 આશિષં વદત, યે ચ યુષ્માન્ ઋતીયન્તે, તેષાં મજ્જલં કુરુત, યે ચ યુષ્માન્
 નિન્દન્તિ, તાઽયન્તિ ચ, તેષાં કૃતે પ્રાર્થયધ્વં| 45 તત્ર યઃ સતામસતાઞ્ચોપરિ
 પ્રભાકરમ્ ઉદાયયતિ, તથા ધાર્મિકાનામધાર્મિકાનાઞ્ચોપરિ નીરં વર્ષયતિ
 તાદૃશો યો યુષ્માકં સ્વર્ગસ્થઃ પિતા, યૂયં તસ્યૈવ સન્તાના ભવિષ્યથ| 46 યે
 યુષ્માસુ પ્રેમ કુર્વન્તિ, યૂયં યદિ કેવલં તેવ્વેવ પ્રેમ કુરુથ, તર્હિ યુષ્માકં કિં
 ફલં ભવિષ્યતિ? ચાઽલા અપિ તાદૃશં કિં ન કુર્વન્તિ? 47 અપરં યૂયં યદિ
 કેવલં સ્વીયભ્રાતૃત્વેન નમત, તર્હિ કિં મહત્ કર્મ કુરુથ? ચાઽલા અપિ
 તાદૃશં કિં ન કુર્વન્તિ? 48 તસ્માત્ યુષ્માકં સ્વર્ગસ્થઃ પિતા યથા પૂર્ણો
 ભવતિ, યૂયમપિ તાદૃશા ભવત|

6 सावधाना भवत, मनुजान् दर्शयितुं तेषां गोचरे धर्मकर्म मा कुरुत, तथा कृते युष्माकं स्वर्गस्थपितुः सकाशात् किञ्चन इलं न प्राप्स्यथ | 2 त्वं यदा ददासि तदा कपटिनो जना यथा मनुजेभ्यः प्रशंसां प्राप्नुं भजनभवने राजमार्गे य तूरीं वाद्यन्ति, तथा मा कुरि, अहं तुभ्यं यथार्थं कथयामि, ते स्वकायं इलम् अलभन्त | 3 किन्तु त्वं यदा ददासि, तदा निजदक्षिणकरो यत् करोति, तद् वामकरं मा ज्ञापय | 4 तेन तव दानं गुप्तं भविष्यति यस्तु तव पिता गुप्तदर्शी, स प्रकाश्य तुभ्यं इलं दास्यति | 5 अपरं यदा प्रार्थयसे, तदा कपटिनयव मा कुरु, यस्मात् ते भजनभवने राजमार्गस्य कोणे तिष्ठन्तो लोकान् दर्शयन्तः प्रार्थयितुं प्रीयन्ते; अहं युष्मान् तथ्यं वदामि, ते स्वकीयइलं प्राप्नुवन् | 6 तस्मात् प्रार्थनाकाले अन्तरागारं प्रविश्य द्वारं रुद्व्या गुप्तं पश्यतस्तव पितुः समीपे प्रार्थयस्व; तेन तव यः पिता गुप्तदर्शी, स प्रकाश्य तुभ्यं इलं दास्यति 7 अपरं प्रार्थनाकाले देवपूजायव मुधा पुनरुक्तिं मा कुरु, यस्मात् ते बोधन्ते, बहुवारं कथायां कथितायां तेषां प्रार्थना ग्राह्यते | 8 यूयं तेषामिव मा कुरुत, यस्मात् युष्माकं यद् यत् प्रयोजनं याचनातः प्रागेव युष्माकं पिता तत् जानाति | 9 अतयेव यूयम् षट्कं प्रार्थयध्वं, हे अस्माकं स्वर्गस्थपितः, तव नाम पूज्यं भवतु | 10 तव राजत्वं भवतु; तवेच्छा स्वर्गे यथा तथैव भेदिन्यामपि सइला भवतु | 11 अस्माकं प्रयोजनीयम् आहारम् अध देहि | 12 वयं यथा निजापराधिनः क्षमामहे, तथैवास्माकम् अपराधान् क्षमस्व | 13 अस्मान् परीक्षां मानय, किन्तु पापात्मनो रक्ष; राजत्वं गौरवं पराक्रमः अते सर्वे सर्वदा तव; तथास्तु | 14 यदि यूयम् अन्येषाम् अपराधान् क्षमध्वे तर्हि युष्माकं स्वर्गस्थपितापि युष्मान् क्षमिष्यते; 15 किन्तु यदि यूयम् अन्येषाम् अपराधान् न क्षमध्वे, तर्हि युष्माकं जनकोपि युष्माकम् अपराधान् न क्षमिष्यते | 16 अपरम् उपवासकाले कपटिनो जना मानुषान् उपवासं ज्ञापयितुं स्वेषां वदनानि म्लानानि कुर्वन्ति, यूयं तयव विषण्णवदना मा भवत; अहं युष्मान् तथ्यं वदामि ते स्वकीयइलम् अलभन्त | 17 यदा त्वम् उपवससि, तदा यथा लोकैस्त्वं उपवासीव न दृश्यसे, किन्तु तव योऽगोचरः पिता तेनैव दृश्यसे, तत्कृते निजशिरसि तैलं भर्दय वदनञ्च प्रक्षालय; 18 तेन तव यः पिता गुप्तदर्शी स प्रकाश्य तुभ्यं इलं दास्यति | 19 अपरं यत्र

સ્થાને કીટાઃ કલક્રુશ્ચ ક્ષયં નયન્તિ, ચૌરાશ્ચ સન્ધિં કર્ત્તયિત્વા ચોરયિતું
 શકનુવન્તિ, તાદૃશ્યાં મેદિન્યાં સ્વાર્થં ધનં મા સંચિનુત | 20 કિન્તુ યત્ર સ્થાને
 કીટાઃ કલક્રુશ્ચ ક્ષયં ન નયન્તિ, ચૌરાશ્ચ સન્ધિં કર્ત્તયિત્વા ચોરયિતું ન
 શકનુવન્તિ, તાદૃશે સ્વર્ગે ધનં સચ્ચિનુત | 21 યસ્માત્ યત્ર સ્થાને યુષ્માક ધનં
 તત્રૈવ ખાને યુષ્માકં મનાંસિ | 22 લોચનં દેહસ્ય પ્રદીપકં, તસ્માત્ યદિ તવ
 લોચનં પ્રસન્નં ભવતિ, તર્હિ તવ કૃત્સ્નં વપુ ઈપ્તિયુક્તં ભવિષ્યતિ | 23
 કિન્તુ લોચનેડપ્રસન્ને તવ કૃત્સ્નં વપુઃ તમિસ્રયુક્તં ભવિષ્યતિ | અતએવ યા
 દીપ્તિસ્ત્વયિ વિદ્યતે, સા યદિ તમિસ્રયુક્તા ભવતિ, તર્હિ તત્ તમિસ્રં કિયન્
 મહત્ | 24 કોપિ મનુજો દ્વૌ પ્રભૂ સેવિતું ન શકનોતિ, યસ્માદ્ એકં સંમન્ય
 તદન્યં ન સમ્મન્યતે, યદ્વા એકત્ર મનો નિધાય તદન્યમ્ અવમન્યતે; તથા
 યૂયમપીશ્વરં લક્ષ્મીઞ્ચેત્યુભે સેવિતું ન શકનુથ | 25 અપરમ્ અહં યુષ્મભ્યં
 તથ્યં કથયામિ, કિં ભક્ષિષ્યામઃ? કિં પાસ્યામઃ? ઇતિ પ્રાણધારણાય મા
 ચિન્તયત; કિં પરિધાસ્યામઃ? ઇતિ કાયરક્ષણાય ન ચિન્તયત; ભક્ષ્યાત્ પ્રાણા
 વસનાઞ્ચ વપૂંષિ કિં શ્રેષ્ઠાણિ ન હિ? 26 વિહાયસો વિહજ્ઞમાન્ વિલોકયત;
 તૈ નોચિતે ન કૃત્યતે ભાણડાગારે ન સઞ્ચીયતેડપિ; તથાપિ યુષ્માકં સ્વર્ગસ્થઃ
 પિતા તેભ્ય આહારં વિતરતિ | 27 યૂયં તેભ્યઃ કિં શ્રેષ્ઠા ન ભવથ? યુષ્માકં
 કશ્ચિત્ મનુજઃ ચિન્તયન્ નિજાયુષઃ ક્ષણમપિ વર્દ્ધયિતું શકનોતિ? 28 અપરં
 વસનાય કુતશ્ચિન્તયત? ક્ષેત્રોત્પન્નાનિ પુષ્પાણિ કથં વર્દ્ધન્તે તદાલોચયત |
 તાનિ તન્તૂન્ નોત્પાદયન્તિ કિમપિ કાર્યં ન કુર્વન્તિ; 29 તથાપ્યહં યુષ્માન્
 વદામિ, સુલેમાન્ તાદૃગ્ ઐશ્વર્યવાનપિ તત્પુષ્પમિવ વિભૂષિતો નાસીત્ |
 30 તસ્માત્ ક્ષધ વિદ્યમાનં શ્રઃ યુલ્લ્યાં નિક્ષેપ્સ્યતે તાદૃશં યત્ ક્ષેત્રસ્થિતં
 કુસુમં તત્ યદીશ્ચર ઇત્યં ભિભૂષયતિ, તર્હિ હે સ્તોકપ્રત્યયિનો યુષ્માન્ કિં ન
 પરિધાપયિષ્યતિ? 31 તસ્માત્ અસ્માભિઃ કિમત્સ્યતે? કિઞ્ચ પાયિષ્યતે?
 કિં વા પરિધાયિષ્યતે, ઇતિ ન ચિન્તયત | 32 યસ્માત્ દેવાર્ચકા અપીતિ
 યેષ્ટન્તે; એતેષુ દ્રવ્યેષુ પ્રયોજનમસ્તીતિ યુષ્માકં સ્વર્ગસ્થઃ પિતા જાનાતિ |
 33 અતએવ પ્રથમત ઈશ્વરીચરાજ્યં ધર્મઞ્ચ યેષ્ટધ્વં, તત એતાનિ વસ્તૂનિ
 યુષ્મભ્યં પ્રદાયિષ્યન્તે | 34 શ્વઃ કૃતે મા ચિન્તયત, શ્વએવ સ્વયં સ્વમુદ્દિશ્ય
 ચિન્તયિષ્યતિ; અધતની યા ચિન્તા સાધકૃતે પ્રચુરતરા |

7 यथा यूयं द्रोणीकृता न भवथ, तत्कृतेऽन्यं द्रोषिणं मा कुरुत। 2 यतो यादृशेन द्रोषेण यूयं परान् द्रोषिणः कुरुथ, तादृशेन द्रोषेण यूयमपि द्रोणीकृता भविष्यथ, अन्यत्र येन परिमाणेन युष्माभिः परिभियते, तेनैव परिमाणेन युष्मत्कृते परिमायिष्यते। 3 अपरत्र निजनयने या नासा विधते, ताम् अनालोच्य तव सङ्गस्य लोचने यत् तृणम् आस्ते, तदेव कुतो वीक्षसे? 4 तव निजलोचने नासायां विधमानायां, हे भ्रातः, तव नयनात् तृणं बहिष्कर्तुं अनुजानीहि, कथामेतां निजसङ्गाय कथं कथयितुं शक्नोषि? 5 हे कपटिन्, आदौ निजनयनात् नासां बहिष्कुरु ततो निजदृष्टौ सुप्रसन्नायां तव भ्रातृ लोचयनात् तृणं बहिष्कर्तुं शक्यसि। 6 अन्यत्र सारमेयेभ्यः पवित्रवस्तूनि मा वितरत, वराडाणां समक्षत्र मुक्ता मा निक्षिपत; निक्षेपाणात् ते ताः स्वर्वाः पदैर् ईलयिष्यन्ति, परावृत्य युष्मानपि विदारयिष्यन्ति। 7 यायध्वं ततो युष्मभ्यं दायिष्यते; मृगयध्वं तत उद्देशं लप्स्यध्वे; द्वारम् आहत, ततो युष्मत्कृते मुक्तं भविष्यति। 8 यस्माद् येन याय्यते, तेन लभ्यते; येन मृग्यते तेनोद्देशः प्राप्यते; येन य द्वारम् आहन्यते, तत्कृते द्वारं मोच्यते। 9 आत्मजेन पूषे प्रार्थिते तस्मै पाषाणं विश्राणयति, 10 भीने यायिते य तस्मै भुजगं वितरति, अतादृशः पिता युष्माकं मध्ये क आस्ते? 11 तस्माद् यूयम् अत्तद्राः सन्तोऽपि यद्वि निजबालकेभ्य उन्नतं द्रव्यं द्यातुं जानीथ, तर्हि युष्माकं स्वर्गस्थः पिता स्वीययायकेभ्यः किमुत्तमानि वस्तूनि न दारयति? 12 यूष्मान् प्रतीतरेषां यादृशो व्यवहारो युष्माकं प्रियः, यूयं तान् प्रति तादृशानेव व्यवहारान् विधत्त; यस्माद् व्यवस्थाभविष्यद्वादिनां वयनानाम् षति सारम्। 13 सङ्कीर्णद्वारेण प्रविशत; यतो नरकगमनाय यद् द्वारं तद् विस्तीर्णं यय्य वर्त्म तद् बृहत् तेन बहवः प्रविशन्ति। 14 अपरं स्वर्गगमनाय यद् द्वारं तत् कीदृक् संकीर्णं। यय्य वर्त्म तत् कीदृग् दुर्गमम्। तद्दुष्टारः कियन्तोऽल्पाः। 15 अपरत्र ये जना भेषवेशेन युष्माकं समीपम् आगच्छन्ति, किन्त्वन्तर्द्वन्ता वृका अतादृशेभ्यो भविष्यद्वादिभ्यः सावधाना भवत, यूयं इलेन तान् परियेतुं शक्नुथ। 16 मनुजाः किं कष्टकिनो वृक्षाद् द्राक्षाङ्गलानि शृगालकोलितश्च उडुम्बरङ्गलानि शातयन्ति? 17 तद्गद् उत्तम अेव पादप उत्तमङ्गलानि जनयति, अधमपादपअेवाधमङ्गलानि जनयति। 18 किन्तूत्तमपादपः कदाप्यधमङ्गलानि जनयितुं न शक्नोति,

तथाधमोपि पादप उत्तमङ्गलानि जनयितुं न शक्नोति | 19 अपरं ये ये
 पादपा अधमङ्गलानि जनयन्ति, ते कृत्ता वल्लौ क्षिप्यन्ते | 20 अतएव यूयं
 झलेन तान् परिशेष्यथ | 21 ये जना मां प्रभुं वदन्ति, ते सर्व्ये स्वर्गराज्यं
 प्रवेक्ष्यन्ति तन्न, किन्तु यो मानवो मम स्वर्गस्थस्य पितुरिष्टं कर्म करोति
 स अेव प्रवेक्ष्यति | 22 तद् द्विने ढवो मां वद्विष्यन्ति, हे प्रढो हे प्रढो,
 तव नाम्ना किमस्माभि र्भविष्यद्वाक्यं न व्याहृतं? तव नाम्ना ढूताः किं न
 त्याजिताः? तव नाम्ना किं नानाद्भूतानि कर्माणि न कृतानि? 23 तदाहं
 वद्विष्यामि, हे कुकर्माकारिणो युष्मान् अहं न वेदि, यूयं मत्समीपाद्
 दूरीढवत | 24 यः कश्चित् ममैताः कथाः श्रुत्वा पालयति, स पाषाणोपरि
 गृहनिर्मात्रा ज्ञानिना सड मयोपमीयते | 25 यतो वृष्टौ सत्याम् आप्लाव
 आगते वायौ वाते य तेषु तद्गुहं लग्नेषु पाषाणोपरि तस्य ढित्तेस्तन्न पतति
 26 किन्तु यः कश्चित् ममैताः कथाः श्रुत्वा न पालयति स सैकते गेहनिर्मात्रा
 ऽज्ञानिना उपमीयते | 27 यतो जलवृष्टौ सत्याम् आप्लाव आगते पवने
 वाते य तैर्गृहे समाघाते तत् पतति तत्पतनं मड्ढ ढवति | 28 यीशुनैतेषु
 वाक्येषु समापितेषु मानवास्तदीयोपदेशम् आश्चर्य्य मेनिरे | 29 यस्मात् स
 उपाध्याया षव तान् नोपदिदेश किन्तु समर्थपुरुषषव समुपदिदेश |

8 यदा स पर्वताद् अवारोडत् तदा ढवो मानवास्तत्पश्चाद् वप्रजुः | 2
 अेकः कुष्ठवान् आगत्य तं प्रणाम्य ढढाषे, हे प्रढो, यद्वि ढवान् संमन्यते,
 तर्हि मां निरामयं कर्तुं शक्नोति | 3 ततो यीशुः करं प्रसार्य्य तस्याङ्गं
 स्पृशन् व्याजडार, सम्मन्येडहं त्वं निरामयो ढव; तेन स तत्क्षणात्
 कुष्ठेनाढोयि | 4 ततो यीशुस्तं जगाद, अवघेडि कथामेतां कश्चिदपि
 मा ढ्रूडि, किन्तु याजकस्य सन्निधिं गत्वा स्वात्मानं दर्शय ढनुजेढ्यो
 निजनिरामयत्वं प्रमाणायितुं ढूसानिडुपितं द्रव्यम् उत्सृज य | 5 तदनन्तरं
 यीशुना कङ्कर्नाडूढ्नाढनि नगरे प्रविष्टे कश्चित् शतसेनापतिस्तत्समीपम्
 आगत्य विनीय ढढाषे, 6 हे प्रढो, मदीय अेको दासः पक्षाघातव्याधिना
 ढृशं व्यथितः, सतु शयनीय आस्ते | 7 तदानीं यीशुस्तस्मै कथितवान्,
 अहं गत्वा तं निरामयं करिष्यामि | 8 ततः स शतसेनापतिः प्रत्यवदत्, हे
 प्रढो, ढवान् यत् मम गेहमध्यं याति तधोग्यढाजनं नाडमस्मि; वाङ्गात्रम्
 आदिशतु, तेनैव मम दासो निरामयो ढविष्यति | 9 यतो मयि परनिधनेडपि

मम निदेशवश्याः कति कति सेनाः सन्ति, तत अेकस्मिन् याडीत्युक्ते स
 याति, तदन्यस्मिन् अेडीत्युक्ते स आयाति, तथा मम निजदासे कर्म्मैतत्
 कुर्वित्युक्ते स तत् करोति। 10 तदानीं यीशुस्तस्यैतत् वयो निशम्य
 विस्मयापन्नोऽभूत्; निजपश्चाद्गामिनो मानवान् अवोच्य, युष्मान् तथ्यं
 वय्मि, षस्त्रायेलीयलोकानां मध्येऽपि नैतादृशो विश्वासो मया प्राप्तः। 11
 अन्यत्र्याहं युष्मान् वदामि, बहवः पूर्वस्याः पश्चिमायाश्च दिश आगत्य
 षब्राहीमा षखडाका याकूबा य साकम् मिलित्वा समुपवेक्ष्यन्ति; 12 किन्तु
 यत्र स्थाने रोदनन्तर्घर्षणो भवतस्तस्मिन् बहिर्भूततमिस्रे राज्यस्य
 सन्ताना निक्षेप्यन्ते। 13 ततः परं यीशुस्तं शतसेनापतिं जगाद, याहि,
 तव प्रतीत्यनुसारतो मङ्गलं भूयात्; तदा तस्मिन्नेव दएडे तदीयदासो
 निरामयो बभूव। 14 अनन्तरं यीशुः पितरस्य गेडमुपस्थाय ज्वरेण
 पीडितां शयनीयस्थितां तस्य श्वश्रूं वीक्षाञ्चके। 15 ततस्तेन तस्याः करस्य
 स्पृष्टतवात् ज्वरस्तां तत्याज, तदा सा समुत्थाय तान् सिषेवे। 16 अनन्तरं
 सन्ध्यायां सत्यां बहुशो भूतग्रस्तमनुजान् तस्य समीपम् आनिन्युः स य
 वाक्येन भूतान् त्याज्यामास, सर्व्वप्रकारपीडितजनांश्च निरामयान् यकार;
 17 तस्मात्, सर्व्वा दुर्बलतास्माकं तेनैव परिधारिता। अस्माकं सकलं व्याधिं
 सभेव संगृहीतवान्। यदेतद्वयं यिशयियमविष्यद्वादिनोक्तमासीत्, तत्तदा
 सकलमभवत्। 18 अनन्तरं यीशुश्चतुर्दिक्षु जननिवहं विलोक्य तटिन्याः पारं
 यातुं शिष्यान् आदिदेश। 19 तदानीम् अेक उपाध्याय आगत्य कथितवान्,
 हे गुरो, भवान् यत्र यास्यति तत्राहमपि भवतः पश्चाद् यास्यामि। 20 ततो
 यीशु ज्गगाद, क्रोष्टुः स्थातुं स्थानं विधते, विहायसो विहङ्गमानां नीडानि
 य सन्ति; किन्तु मनुष्यपुत्रस्य शिरः स्थापयितुं स्थानं न विधते। 21
 अनन्तरम् अपर अेकः शिष्यस्तं बत्माषे, हे प्रभो, प्रथमतो मम पितरं
 श्मशाने निधातुं गमनार्थं माम् अनुमन्यस्व। 22 ततो यीशुरुक्तवान् मृता
 मृतान् श्मशाने निदधतु, त्वं मम पश्चाद् आगच्छ। 23 अनन्तरं तस्मिन्
 नावमाडूढे तस्य शिष्यास्तत्पश्चात् जग्मुः। 24 पश्चात् सागरस्य मध्यं
 तेषु गतेषु तादृशः प्रबलो ञ्भनिल उदतिष्ठत्, येन महातरङ्ग उत्थाय
 तरङ्गिं छादितवान्, किन्तु स निद्रित आसीत्। 25 तदा शिष्या आगत्य
 तस्य निद्राभङ्गं कृत्वा कथयामासुः, हे प्रभो, वयं भ्रियामहे, भवान् अस्माकं

प्राणान् रक्षतु | 26 तदा स तान् उक्तवान्, हे अल्पविश्वासिनो यूयं कुतो विभीथ? ततः स उत्थाय वातं सागरञ्च तर्जयामास, ततो निर्व्यातमभवत् | 27 अपरं मनुजा विस्मयं विलोक्य कथयामासुः, अहो वातसरित्पती अस्य किमाज्ञाग्राहिलौ? कीदृशोऽयं मानवः | 28 अनन्तरं स पारं गत्वा गिद्वेरीयदेशम् उपस्थितवान्; तदा द्वौ भूतग्रस्तमनुजौ श्मशानस्थानाद् बहिर्भूत्वा तं साक्षात् कृतवन्तौ, तावेतादृशौ प्रयाद्वास्तां यत् तेन स्थानेन कोपि यातुं नाशक्नोत् | 29 तावुयैः कथयामासतुः, हे ईश्वरस्य सूनो यीशो, त्वया साकम् आवयोः कः सम्बन्धः? निरूपितकालात् प्रागेव किमावाभ्यां यातनां दातुम् अत्रागतोसि? 30 तदानीं ताभ्यां किञ्चिद् दूरे वराडाणाम् अेको मडाप्रजोऽयत् | 31 ततो भूतौ तौ तस्यान्तिके विनीय कथयामासतुः, यधावां त्याजयसि, तर्हि वराडाणां मध्येप्रजम् आवां प्रेरय | 32 तदा यीशुरवदत् यातं, अनन्तरं तौ यदा मनुजौ विडाय वराडान् आश्रितवन्तौ, तदा ते सर्वे वराडा उच्यस्थानात् मडाजवेन धावन्तः सागरीयतोये मज्जन्तो मभ्रुः | 33 ततो वराडरक्षकाः पलायमाना मध्येनगरं तौ भूतग्रस्तौ प्रति यधद् अघटत, ताः सर्व्ववार्त्ता अवदन् | 34 ततो नागरिकाः सर्व्वे मनुजा यीशुं साक्षात् कर्तुं बहिरायाताः तञ्च विलोक्य प्रार्थयाञ्चकिरे भवान् अस्माकं सीमातो यातु |

9 अनन्तरं यीशुर्नौकामारुह्य पुनः पारमागत्य निजग्रामम् आययौ | 2 ततः कतिपया जना अेकं पक्षाघातिनं स्वट्टोपरि शाययित्वा तत्समीपम् आनयन्; ततो यीशुस्तेषां प्रतीतिं विज्ञाय तं पक्षाघातिनं जगाद, हे पुत्र, सुस्थिरो भव, तव क्लृप्तस्य मर्षाणं जातम् | 3 तां कथां निशाम्य क्रियन्त उपाध्याया मनःसु चिन्तितवन्त अेष मनुज ईश्वरं निन्दति | 4 ततः स तेषाम् अेतादृशीं चिन्तां विज्ञाय कथितवान्, यूयं मनःसु कृत अेतादृशीं कुचिन्तां कुरुथ? 5 तव पापमर्षाणं जातं, यद्वा त्वमुत्थाय गच्छ, द्वयोरनयो वाक्ययोः किं वाक्यं वक्तुं सुगमं? 6 किन्तु मेदिन्यां क्लृप्तं क्षमितुं मनुजसुतस्य सामर्थ्यमस्तीति यूयं यथा जानीथ, तदर्थं स तं पक्षाघातिनं गदितवान्, उत्तिष्ठ, निजशयनीयं आदाय गेदं गच्छ | 7 ततः स तत्क्षणाद् उत्थाय निजगेदं प्रस्थितवान् | 8 मानवा एत्थं विलोक्य विस्मयं मेनिरे, ईश्वरेण मानवाय सामर्थ्यम् ईदृशं दत्तं एति कारणात् तं धन्यं बभाषिरे

य। 9 अनन्तरं यीशुस्तत्स्थानाद् गच्छन् गच्छन् करसंग्रहस्थाने समुपविष्टं
 भयिनामानम् अेकं मनुजं विलोक्य तं बभाषे, मम पश्चाद् आगच्छ,
 ततः स उत्थाय तस्य पश्चाद् वप्राज। 10 ततः परं यीशौ गृहे लोक्तुम्
 उपविष्टे बलवः करसंग्राहिणः कलुषिणश्च मानवा आगत्य तेन साकं तस्य
 शिष्यैश्च साकम् उपविविशुः। 11 डिइशिनस्तद् दृष्ट्वा तस्य शिष्यान्
 बभाषिरे, युष्माकं गुरुः किं निमित्तं करसंग्राहिभिः कलुषिभिश्च साकं
 लुंक्ते? 12 यीशुस्तत् श्रुत्वा तान् प्रत्यवदत्, निरामयलोकानां चिकित्सकेन
 प्रयोजनं नास्ति, किन्तु सामयलोकानां प्रयोजनमास्ते। 13 अतो यूयं यात्वा
 वयनस्यास्यार्थं शिक्षध्वम्, दयायां मे यथा प्रीतिर्न तथा यज्ञकर्म्मणि।
 यतोऽदं धार्मिकान् आह्वातुं नागतोऽस्मि किन्तु मनः परिवर्तयितुं पापिन
 आह्वातुम् आगतोऽस्मि। 14 अनन्तरं योहनः शिष्यास्तस्य समीपम्
 आगत्य कथयामासुः, डिइशिनो वयञ्च पुनः पुनरुपवसामः, किन्तु तव
 शिष्या नोपवसन्ति, कुतः? 15 तदा यीशुस्तान् अवोचत् यावत् सभीनां
 संज्ञे कन्याया वरस्तिष्ठति, तावत् किं ते विलापं कर्तुं शक्यवन्ति? किन्तु
 यदा तेषां संज्ञाद् वरं नयन्ति, तादृशः समय आगमिष्यति, तदा ते
 उपवत्स्यन्ति। 16 पुरातनवसने कोपि नवीनवस्त्रं न योजयति, यस्मात्
 तेन योजितेन पुरातनवसनं छिनत्ति तच्छिद्रञ्च बद्धुकुत्सितं दृश्यते। 17
 अन्यञ्च पुरातनकुत्वां कोपि नवानगोस्तनीरसं न निदधाति, यस्मात् तथा
 कृते कुतू विदीर्यते तेन गोस्तनीरसः पतति कुतूश्च नश्यति; तस्मात्
 नवीनायां कुत्वां नवीनो गोस्तनीरसः स्थाप्यते, तेन द्वयोरयनं भवति। 18
 अपरं तेनैतत्कथाकथनकाले अेकोऽधिपतिस्तं प्राण्य बभाषे, मम दृष्टिता
 प्रायेणैतावत्काले मृता, तस्माद् भवानागत्य तस्या गात्रे हस्तमर्पयतु,
 तेन सा जिविष्यति। 19 तदानीं यीशुः शिष्यैः साकम् उत्थाय तस्य
 पश्चाद् वप्राज। 20 एत्यनन्तरे द्वादशवत्सरान् यावत् प्रदेशमयेन शीर्षोका
 नारी तस्य पश्चाद् आगत्य तस्य वसनस्य ग्रन्थिं पस्पर्श; 21 यस्मात्
 मया केवलं तस्य वसनं स्पृष्ट्वा स्वास्थ्यं प्राप्स्यते, सा नारीति मनसि
 निश्चितवती। 22 ततो यीशुर्वदनं परावर्त्य तां जगाद, हे कन्ये, त्वं सुस्थिरा
 भव, तव विश्वासस्त्वां स्वस्थामकार्षीत्। अतद्वाक्ये गदितमेव सा योषित्
 स्वस्थाभूत्। 23 अपरं यीशुस्तस्याध्यक्षस्य गेहं गत्वा वादकप्रभृतीन् बद्धून्

લોકાન્ શબ્દાયમાનાન્ વિલોક્ય તાન્ અવદત્, 24 પન્થાન્ ત્યજ, કન્યેયં
 નામ્રિયત નિદ્રિતાસ્તે; કથામેતાં શ્રુત્વા તે તમુપજહસુઃ | 25 કિન્તુ સર્વેષુ
 બહિષ્કૃતેષુ સોડભ્યન્તરં ગત્વા કન્યાયાઃ કરં ધૃતવાન્, તેન સોદતિષ્ઠત્; 26
 તતસ્તત્કર્માણો યશઃ કૃત્સ્નં તં દેશં વ્યાપ્તવત્ | 27 તતઃ પરં યીશુસ્તસ્માત્
 સ્થાનાદ્ યાત્રાં ચકાર; તદા હે દાયુદઃ સન્તાન, અસ્માન્ દયસ્વ, ઇતિ વદન્તૌ
 દ્વૌ જનાવન્ધૌ પ્રોચૈરાહૂયન્તૌ તત્પશ્ચાદ્ વપ્રજતુઃ | 28 તતો યીશૌ ગેહમધ્યં
 પ્રવિષ્ઠં તાવપિ તસ્ય સમીપમ્ ઉપસ્થિતવન્તૌ, તદાનીં સ તૌ પૃષ્ટવાન્ કર્મૈતત્
 કર્તુ મમ સામર્થ્યમ્ આસ્તે, યુવાં કિમિતિ પ્રતીથઃ? તદા તૌ પ્રત્યૂયતુઃ, સત્યં
 પ્રભો | 29 તદાનીં સ તયો લૌચિનાનિ સ્પૃશન્ બભાષે, યુવયોઃ પ્રતીત્યનુસારાદ્
 યુવયો મ્ફલં ભૂયાત્ | તેન તત્ક્ષણાત્ તયો નેત્રાણિ પ્રસન્નાન્યભવન્, 30
 પશ્ચાદ્ યીશુસ્તૌ દૃઢમાજ્ઞાપ્ય જગાદ, અવધત્તમ્ એતાં કથાં કોપિ મનુજો
 મ જાનીયાત્ | 31 કિન્તુ તૌ પ્રસ્થાય તસ્મિન્ કૃત્સ્ને દેશે તસ્ય કીર્તિં
 પ્રકાશયામાસતુઃ | 32 અપરં તૌ બહિર્યાત એતસ્મિન્નન્તરે મનુજા એકં
 ભૂતગ્રસ્તમૂકં તસ્ય સમીપમ્ આનીતવન્તઃ | 33 તેન ભૂતે ત્યાજિતે સ મૂકઃ
 કથાં કથયિતું પ્રારભત, તેન જના વિસ્મયં વિજ્ઞાય કથયામાસુઃ, ઇસ્રાયેલો
 વંશે કદાપિ નેદૃગદૃશ્યત; 34 કિન્તુ ફિરૂશિનઃ કથયાઞ્ચકુઃ ભૂતાધિપતિના
 સ ભૂતાન્ ત્યાજયતિ | 35 તતઃ પરં યીશુસ્તેષાં ભજનભવન ઉપદિશન્
 રાજ્યસ્ય સુસંવાદં પ્રચારયન્ લોકાનાં યસ્ય ય આમયો યા ચ પીડાસીત્,
 તાન્ શમયન્ શમયંશ્ચ સર્વાણિ નગરાણિ ગ્રામાંશ્ચ બભ્રામ | 36 અન્યઞ્ચ
 મનુજાન્ વ્યાકુલાન્ અરક્ષકમેષાનિવ ચ ત્યક્તાન્ નિરીક્ષ્ય તેષુ કારુણિકઃ
 સન્ શિષ્યાન્ અવદત્, 37 શસ્યાનિ પ્રચુરાણિ સન્તિ, કિન્તુ છેત્તારઃ સ્તોકાઃ |
 38 ક્ષેત્રં પ્રત્યપરાન્ છેદકાન્ પ્રહેતું શસ્યસ્વામિનં પ્રાર્થયધ્વમ્ |

10 અનન્તરં યીશુ દ્વાદશશિષ્યાન્ આહૂયામેધ્યભૂતાન્ ત્યાજયિતું
 સર્વપ્રકારરોગાન્ પીડાશ્ચ શમયિતું તેભ્યઃ સામર્થ્યમદાત્ | 2 તેષાં
 દ્વાદશપ્રેચ્યાણાં નામાન્યેતાનિ | પ્રથમં શિમોન્ યં પિતરં વદન્તિ, તતઃ
 પરં તસ્ય સહજ આન્દ્રિયઃ, સિવદિયસ્ય પુત્રો યાકૂબ્ 3 તસ્ય સહજો
 યોહન્; ફિલિપ્ બર્થલમય્ થોમાઃ કરસંગ્રાહી મથિઃ, આલ્ફેયપુત્રો યાકૂબ્, 4
 કિનાનીયઃ શિમોન્, ય ઇષ્કરિયોતીયયિહૂદાઃ ખ્રીષ્ટં પરકરેડર્પયત્ | 5 એતાન્
 દ્વાદશશિષ્યાન્ યીશુઃ પ્રેષયન્ ઇત્યાજ્ઞાપયત્, યૂયમ્ અન્યદેશીયાનાં પદવીં

શેમિરોણીયાનાં કિમપિ નગરઞ્ચ ન પ્રવિશ્યે 6 ઇસ્રાયેલ્ગોત્રસ્ય હારિતા યે યે
 મેષાસ્તેષામેવ સમીપં યાત | 7 ગત્વા ગત્વા સ્વર્ગસ્ય રાજત્વં સવિધમભવત્,
 એતાં કથાં પ્રચારયત | 8 આમયગ્રસ્તાન્ સ્વસ્થાન્ કુરુત, કુષ્ઠિનઃ પરિષ્કુરુત,
 મૃતલોકાન્ જીવયત, ભૂતાન્ ત્યાજયત, વિના મૂલ્યં યૂયમ્ અલભધ્વં વિનૈવ
 મૂલ્યં વિશ્રાણયત | 9 કિન્તુ સ્વેષાં કટિબન્ધેષુ સ્વર્ણરૂપ્યતામ્રાણાં કિમપિ
 ન ગૃહ્ણીત | 10 અન્યચ્ચ યાત્રાયૈ ચેલસમ્પુટં વા દ્વિતીયવસનં વા પાદુકે
 વા યષ્ટિઃ, એતાન્ મા ગૃહ્ણીત, યતઃ કાર્યકૃત્ ભર્તુ યોગ્યો ભવતિ | 11
 અપરં યૂયં યત્ પુરં યત્ર ગ્રામં પ્રવિશથ, તત્ર યો જનો યોગ્યપાત્રં તમવગત્ય
 યાનકાલં યાવત્ તત્ર તિષ્ઠત | 12 યદા યૂયં તદ્ગ્રહં પ્રવિશથ, તદા તમાશિષં
 વદત | 13 યદિ સ યોગ્યપાત્રં ભવતિ, તર્હિ તત્કલ્યાણં તસ્મૈ ભવિષ્યતિ,
 નોયેત્ સાશીર્યુષ્મભ્યમેવ ભવિષ્યતિ | 14 કિન્તુ યે જના યુષ્માકમાતિથ્યં
 ન વિદધતિ યુષ્માકં કથાઞ્ચ ન શૃણ્વન્તિ તેષાં ગેહાત્ પુરાદ્વા પ્રસ્થાનકાલે
 સ્વપદ્મલીઃ પાતયત | 15 યુષ્માનહં તથ્યં વચ્ચિ વિચારદિને તત્પુરસ્ય દશાતઃ
 સિદોમમોરાપુરયોર્દશા સદ્ગતરા ભવિષ્યતિ | 16 પશ્યત, વૃકયૂથમધ્યે
 મેષઃ યથાવિસ્તથા યુષ્માન પ્રહિણોમિ, તસ્માદ્ યૂયમ્ અહિરિવ સતર્કાઃ
 કપોતાઇવાર્હિસકા ભવત | 17 નૃભ્યઃ સાવધાના ભવત; યતસ્તૈ યૂયં
 રાજસંસદિ સમર્પિષ્યધ્વે તેષાં ભજનગેહે પ્રહારિષ્યધ્વે | 18 યૂયં મન્નામહેતોઃ
 શાસ્તૃણાં રાજાઞ્ચ સમક્ષં તાનન્યદેશિનશ્ચાધિ સાક્ષિત્વાર્થમાનેષ્યધ્વે | 19
 કિન્તિવત્યં સમર્પિતા યૂયં કથં કિમુત્તરં વક્ષ્યથ તત્ર મા ચિન્તયત, યતસ્તદા
 યુષ્માભિ ર્યદ્ વક્તવ્યં તત્ તદ્દણ્ડે યુષ્મન્મનઃ સુ સમુપસ્થાસ્યતિ | 20
 યસ્માત્ તદા યો વક્ષ્યતિ સ ન યૂયં કિન્તુ યુષ્માકમન્તરસ્થઃ પિત્રાત્મા | 21
 સહજઃ સહજં તાતઃ સુતઞ્ચ મૃતૌ સમર્પયિષ્યતિ, અપત્યાગિ સ્વસ્વપિત્રો
 વિપક્ષીભૂય તૌ ઘાતયિષ્યન્તિ | 22 મન્નમહેતોઃ સર્વ્યે જના યુષ્માન્
 ઋતીયિષ્યન્તે, કિન્તુ યઃ શેષં યાવદ્ ઘૈર્યઃ ઘૃત્વા સ્થાસ્યતિ, સ ત્રાયિષ્યતે |
 23 તૈ ર્યદા યૂયમેકપુરે તાડિષ્યધ્વે, તદા યૂયમન્યપુરં પલાયધ્વં યુષ્માનહં
 તથ્યં વચ્ચિ યાવન્મનુજસુતો નૈતિ તાવદ્ ઇસ્રાયેલ્દેશીયસર્વ્વનગરભ્રમણાં
 સમાપયિતું ન શક્ષ્યથ | 24 ગુરોઃ શિષ્યો ન મહાન્, પ્રભોર્દાસો ન મહાન્ |
 25 યદિ શિષ્યો નિજગુરો દાસશ્ચ સ્વપ્રભોઃ સમાનો ભવતિ તર્હિ તદ્ યથેષ્ટં |
 યેતૈર્ગૃહપતિર્ભૂતરાજ ઉચ્યતે, તર્હિ પરિવારાઃ કિં તથા ન વક્ષ્યન્તે? 26

किन्तु तेभ्यो यूयं मा बिभीत, यतो यन्न प्रकाशिष्यते, तादृक् छादितं
किमपि नास्ति, यस्य न व्यञ्जिष्यते, तादृग् गुप्तं किमपि नास्ति | 27 यदहं
युष्मान् तमस्मि वय्मि तद् युष्माभिर्दीप्तौ कथ्यतां; कर्णाभ्यां यत् श्रूयते
तद् गेहोपरि प्रयार्थ्यतां | 28 ये कायं हन्तुं शक्नुवन्ति नात्मानं, तेभ्यो मा
भैष्ट; यः कायात्मानौ निरये नाशयितुं, शक्नोति, ततो बिभीत | (Geenna
g1067) 29 द्वौ यटकौ किमेकताम्रमुद्रया न विक्रीयेते? तथापि युष्मत्तातानुमतिं
विना तेषामेकोपि भुवि न पतति | 30 युष्मच्छिरसां सर्व्वक्या गणितानां
सन्ति | 31 अतो मा बिभीत, यूयं बहुयटकेभ्यो बहुमूल्याः | 32
यो मनुजसाक्षान्मामङ्गीकुरुते तमहं स्वर्गस्थतातसाक्षादङ्गीकरिष्ये | 33
पृथ्व्यामहं शान्तिं दातुमागतमिति मानुभवत, शान्तिं दातुं न किन्त्वसिं |
34 पितृमातृश्रूभिः साकं सुतसुताबधू विरोधयितुञ्चागतेस्मि | 35 ततः
स्वस्वपरिवारभेव नृशत्रु र्भविता | 36 यः पितरि मातरि वा भक्तोधिकं
प्रीयते, स न मर्दः; 37 यश्च सुते सुतायां वा भक्तोधिकं प्रीयते, सेपि
न मर्दः | 38 यः स्वकुशं गृह्णन् मत्पश्चान्नैति, सेपि न मर्दः | 39 यः
स्वप्राणानवति, स तान् हारयिष्यते, यस्तु मत्कृते स्वप्राणान् हारयति, स
तानवति | 40 यो युष्माकमातिथ्यं विदधाति, स ममातिथ्यं विदधाति, यश्च
ममातिथ्यं विदधाति, स मत्प्रेरकस्यातिथ्यं विदधाति | 41 यो भविष्यद्वादीति
ज्ञात्वा तस्यातिथ्यं विधत्ते, स भविष्यद्वादिनः इलं लप्स्यते, यश्च धार्मिक
एति विदित्वा तस्यातिथ्यं विधत्ते स धार्मिकमानवस्य इलं प्राप्स्यति | 42
यश्च कश्चित् अतेषां क्षुद्रनराणाम् यं कञ्चनैकं शिष्य एति विदित्वा कंसैकं
शीतलसलिलं तस्मै दत्ते, युष्मानहं तथ्यं वदामि, स केनापि प्रकारेण इलेन
न वञ्जिष्यते |

11 एत्थं यीशुः स्वद्वादशशिष्याणामाज्ञापनं समाप्य पुरे पुरे उपदेष्टुं
सुसंवाहं प्रयारयितुं तत्स्थानात् प्रतस्थे | 2 अनन्तरं योहन् कारायां तिष्ठन्
भ्रिष्टस्य कर्माणां वार्त्तां प्राप्य यस्यागमनवार्त्तासीत् सभेव किं त्वं? वा
वयमन्यम् अपेक्षिष्यामहे? 3 अतत् प्रष्टुं निजौ द्वौ शिष्यौ प्राडिणोत् |
4 यीशुः प्रत्यवोयत्, अन्धा नेत्राणि लभन्ते, अत्रा गच्छन्ति, कुष्ठिनः
स्वस्था भवन्ति, बधिराः शृण्वन्ति, मृता जिवन्त उत्तिष्ठन्ति, दरिद्राणां
समीपे सुसंवाहः प्रयार्थ्यत, 5 अेतानि यद्दद् युवां शृणुथः पश्यथश्च गत्वा

તદ્વાર્તા યોહનં ગદતં | 6 યસ્યાહં ન વિઘ્નીભવામિ, સએવ ધન્યઃ | 7
 અનન્તરં તયોઃ પ્રસ્થિતયો રીશુ યોહનમ્ ઉદિશ્ય જનાન્ જગાદ, યૂયં કિં દ્રષ્ટું
 વહિર્મધ્યેપ્રાન્તરમ્ અગચ્છત? કિં વાતેન કમ્પિતં નલં? 8 વા કિં વીક્ષિતું
 વહિર્ગતવન્તઃ? કિં પરિહિતસૂક્ષ્મવસનં મનુજમેકં? પશ્યત, યે સૂક્ષ્મવસનાનિ
 પરિદધતિ, તે રાજધાન્યાં તિષ્ઠન્તિ | 9 તર્હિ યૂયં કિં દ્રષ્ટું બહિરગમત, કિમેકં
 ભવિષ્યદ્વાદિનં? તદેવ સત્યં | યુષ્માનહં વદામિ, સ ભવિષ્યદ્વાદિનોપિ મહાનઃ
 10 યતઃ, પશ્ય સ્વકીયદૂતોયં ત્વદગ્રે પ્રેષ્યતે મયા | સ ગત્વા તવ પન્થાનં
 સ્મયક્ પરિષ્કરિષ્યતિ | | એતદ્વચનં યમધિ લિખિતમાસ્તે સોડયં યોહન |
 11 અપરં યુષ્માનહં તથ્યં બ્રવીમિ, મજ્જયિતુ યોહનઃ શ્રેષ્ઠઃ કોપિ નારીતો
 નાજાયત; તથાપિ સ્વર્ગરાજ્યમધ્યે સર્વેભ્યો યઃ ક્ષુદ્રઃ સ યોહનઃ શ્રેષ્ઠઃ | 12
 અપરઞ્ચ આ યોહનોડધ યાવત્ સ્વર્ગરાજ્યં બલાદાક્રાન્તં ભવતિ આક્રમિનઞ્ચ
 જના બલેન તદધિકુર્વન્તિ | 13 યતો યોહનં યાવત્ સર્વભવિષ્યદ્વાદિભિ
 ર્વવસ્થયા ય ઉપદેશઃ પ્રાકાશ્યત | 14 યદિ યૂયમિદં વાક્યં ગ્રહીતું શક્યુથ,
 તર્હિ શ્રેયઃ, યસ્યાગમનસ્ય વચનમાસ્તે સોડયમ્ એલિયઃ | 15 યસ્ય શ્રોતું
 કણ્ઠો સ્તઃ સ શૃણોતુ | 16 એતે વિદ્યમાનજનાઃ કે મયોપમીયન્તે? યે
 બાલકા હૃદ્ ઉપવિશ્ય સ્વં સ્વં બન્ધુમાહૂય વદન્તિ, 17 વયં યુષ્માકં સમીપે
 વંશીરવાદયામ, કિન્તુ યૂયં નાનૃત્યત; યુષ્માકં સમીપે ય વયમરોદિમ, કિન્તુ
 યૂયં ન વ્યલપત, તાદૃશૌ બાલકૈસ્ત ઉપમાયિષ્યન્તે | 18 યતો યોહન્ આગત્ય
 ન ભુક્તવાન્ ન પીતવાંશ્ચ, તેન લોકા વદન્તિ, સ ભૂતગ્રસ્ત ઇતિ | 19
 મનુજસુત આગત્ય ભુક્તવાન્ પીતવાંશ્ચ, તેન લોકા વદન્તિ, પશ્યત એષ
 ભોક્તા મધપાતા ચણ્ડાલપાપિનાં બન્ધશ્ચ, કિન્તુ જ્ઞાનિનો જ્ઞાનવ્યવહારં
 નિર્દોષં જાનન્તિ | 20 સ યત્ર યત્ર પુરે બહ્વાશ્ચર્યં કર્મ કૃતવાન્, તન્નિવાસિનાં
 મનઃપરાવૃત્ત્યભાવાત્ તાનિ નગરાણિ પ્રતિ હન્તેત્યુક્તા કથિતવાન્, 21
 હા કોરાસીન્, હા બૈત્સૈદે, યુષ્મન્મધ્યે યદદાશ્ચર્યં કર્મ કૃતં યદિ તત્
 સોરસીદોન્નગર અકારિષ્યત, તર્હિ પૂર્વમેવ તન્નિવાસિનઃ શાણવસને
 ભસ્મનિ ચોપવિશન્તો મનાંસિ પરાવર્તિષ્યન્ત | 22 તસ્માદહં યુષ્માન્ વદામિ,
 વિચારદિને યુષ્માકં દશાતઃ સોરસીદોનો દૈશા સહ્યતરા ભવિષ્યતિ | 23
 અપરઞ્ચ બત કર્કનાહૂમ્, ત્વં સ્વર્ગ યાવદુન્નતોસિ, કિન્તુ નરકે નિક્ષેપ્સ્યસે,
 યસ્માત્ ત્વયિ યાન્યાશ્ચર્યાણિ કર્માણ્યકારિષત, યદિ તાનિ સિદોન્નગર

અકારિષ્યન્ત, તર્હિ તદ્દધ યાવદસ્થાસ્યત્ | (Hadēs 986) 24 કિન્તવહં યુષ્માન્
વદામિ, વિચારદિને તવ દાડતઃ સિદોમો દાડો સહ્યતરો ભવિષ્યતિ | 25
એતસ્મિન્નેવ સમયે યીશુઃ પુનરુવાચ, હે સ્વર્ગપૃથિવ્યોરેકાધિપતે પિતસ્ત્વં
જ્ઞાનવતો વિદુષશ્ચ લોકાન્ પ્રત્યેતાનિ ન પ્રકાશ્ય બાલકાન્ પ્રતિ પ્રકાશિતવાન્,
ઇતિ હેતોસ્ત્વાં ધન્યં વદામિ | 26 હે પિતઃ, ઇત્યં ભવેત્ યત ઇદં ત્વદૃષ્ટાવુત્તમં |
27 પિત્રા મયિ સર્વાણિ સમર્પિતાનિ, પિતરં વિના કોપિ પુત્રં ન જાનાતિ, યાન્
પ્રતિ પુત્રેણ પિતા પ્રકાશ્યતે તાન્ વિના પુત્રાદ્ અન્યઃ કોપિ પિતરં ન જાનાતિ |
28 હે પરિશ્રાન્તા ભારાકાન્તાશ્ચ લોકા યૂયં મત્સન્નિધિમ્ આગચ્છત, અહં
યુષ્માન્ વિશ્રામયિષ્યામિ | 29 અહં ક્ષમણશીલો નમ્રમનાશ્ચ, તસ્માત્ મમ
યુગં સ્વેષામુપરિ ધારયત મત્તઃ શિક્ષધ્વઞ્ચ, તેન યૂયં સ્વે સ્વે મનસિ વિશ્રામં
લપ્સ્યધ્મે | 30 યતો મમ યુગમ્ અનાયાસં મમ ભારશ્ચ લઘુઃ |

12 અનન્તરં યીશુ વિશ્રામવારે શ્ચમધ્યેન ગચ્છતિ, તદા તચ્છિષ્યા
બુભુક્ષિતાઃ સન્તઃ શ્ચમઞ્જરીશ્છત્વા છિત્વા ખાદિતુમારભન્ત | 2 તદ્
વિલોક્ય ક્ષિરુશિનો યીશુ જગદ્ગુઃ, પશ્ય વિશ્રામવારે યત્ કર્મ્માકર્ત્તવ્યં તદેવ
તવ શિષ્યાઃ કુર્વન્તિ | 3 સ તાન્ પ્રત્યાવદત, દાયૂદ્ તત્સક્ષિનશ્ચ બુભુક્ષિતાઃ
સન્તો યત્ કર્મ્માકુર્વન્ તત્ કિં યુષ્માભિ નર્પાઠિ? 4 યે દર્શનીયાઃ પૂષ્પાઃ
યાજકાન્ વિના તસ્ય તત્સક્ષિમનુજનાઞ્ચાભોજનીયાસ્ત ઈશ્વરાવાસં પ્રવિષ્ટેન
તેન ભુક્તાઃ | 5 અન્યચ્ચ વિશ્રામવારે મધ્યેમન્દિરં વિશ્રામવારીયં નિયમં
લડ્વન્તોપિ યાજકા નિર્દોષા ભવન્તિ, શાસ્ત્રમધ્યે કિમિદમપિ યુષ્માભિ ન
પઠિતં? 6 યુષ્માનહં વદામિ, અત્ર સ્થાને મન્દિરાદપિ ગરીયાન્ એક આસ્તે |
7 કિન્તુ દયાયાં મે યથા પ્રીતિ ન તથા યજ્ઞકર્મ્મણિ | એતદ્વચનસ્યાર્થં યદિ
યુયમ્ અજ્ઞાસિષ્ટ તર્હિ નિર્દોષાન્ દોષિણો નાકાર્ષ્ટ | 8 અન્યચ્ચ મનુજસુતો
વિશ્રામવારસ્યાપિ પતિરાસ્તે | 9 અનન્તરં સ તત્સ્થાનાત્ પ્રસ્થાય તેષાં
ભજનભવનં પ્રવિષ્ટવાન્, તદાનીમ્ એકઃ શુષ્કકરામયવાન્ ઉપસ્થિતવાન્ |
10 તતો યીશુમ્ અપવદિતું માનુષાઃ પપ્રચ્છુઃ, વિશ્રામવારે નિરામયત્વં કરણીયં
ન વા? 11 તેન સ પ્રત્યુવાચ, વિશ્રામવારે યદિ કસ્યચિદ્ અવિ ગર્ત્તે પતતિ,
તર્હિ યસ્તં ઘૃત્વા ન તોલયતિ, એતાદૃશો મનુજો યુષ્માકં મધ્યે ક આસ્તે? 12
અવે માનવઃ કિં નહિ શ્રેયાન્? અતો વિશ્રામવારે હિતકર્મ્મ કર્ત્તવ્યં | 13
અનન્તરં સ તં માનવં ગદિતવાન્, કરં પ્રસારય; તેન કરે પ્રસારિતે સોન્યકરવત્

स्वस्थोऽभवत् | 14 तदा द्विशिनो बहिर्भूय कथं तं हनिष्याम इति
 कुमन्त्राणां तत्रातिकूल्येन यक्षुः | 15 ततो यीशुस्तद् विदित्वा स्थनान्तरं
 गतवान्; अन्येषु बडुनरेषु तत्पश्चाद् गतेषु तान् स निरामयान् कृत्वा
 एत्याज्ञापयत्, 16 यूयं मां न परियाययत | 17 तस्मात् मम प्रीयो मनोनीतो
 मनसस्तुष्टिकारकः | मदीयः सेवको यस्तु विधते तं समीक्षतां | तस्योपरि
 स्वकीयात्मा मया संस्थापयिष्यते | तेनान्यदेशजातेषु व्यवस्था संप्रकाश्यते |
 18 केनापि न विरोधं स विवाहञ्च करिष्यति | न य राजपथे तेन वयनं
 श्रावयिष्यते | 19 व्यवस्था यलिता यावत् नहि तेन करिष्यते | तावत् नलो
 विदीर्षोऽपि भंक्ष्यते नहि तेन य | तथा सधूमवर्तिञ्च न स निर्व्यापयिष्यते |
 20 प्रत्याशाञ्च करिष्यन्ति तन्नाम्नि भिन्नदेशजाः | 21 यान्येतानि वयनानि
 शिशयियमविष्यद्वादिना प्रोक्तान्यासन्, तानि सङ्गलान्यभवन् | 22 अनन्तरं
 लोके स्तत्समीपम् आनीतो भूतग्रस्तान्धमूकैकमनुजस्तेन स्वस्थीकृतः,
 ततः सोऽन्धो मूको द्रष्टुं वक्तुञ्चारब्धवान् | 23 अनेन सर्वे विस्मिताः
 कथयाञ्चक्रुः, अपेः किं दायूदः सन्तानो नहि? 24 किन्तु द्विशिनस्तत्
 श्रुत्वा गदितवन्तः, बाल्स्त्रिबूढनाम्नो भूतराजस्य साहाय्यं विना नायं
 भूतान् त्याजयति | 25 तदानीं यीशुस्तेषाम् इति मानसं विज्ञाय तान्
 अवदत् किञ्चन राज्यं यदि स्वविपक्षाद् विधते, तर्हि तत् उच्छिद्यते; यच्च
 किञ्चन नगरं वा गृहं स्वविपक्षाद् विभिद्यते, तत् स्थातुं न शक्नोति |
 26 तद्वत् शयतानो यदि शयतानं बहिः कृत्वा स्वविपक्षात् पृथक् पृथक्
 भवति, तर्हि तस्य राज्यं केन प्रकारेण स्थास्यति? 27 अहञ्च यदि
 बाल्स्त्रिबूढा भूतान् त्याजयामि, तर्हि युष्माकं सन्तानाः केन भूतान्
 त्याजयन्ति? तस्माद् युष्माकम् अतद्वियारयितारस्त एव भविष्यन्ति | 28
 किन्तवहं यदीश्वरात्मना भूतान् त्याजयामि, तर्हीश्वरस्य राज्यं युष्माकं
 सन्निधिमागतवत् | 29 अन्यञ्च कोपि बलवन्तं जनं प्रथमतो न बद्ध्वा केन
 प्रकारेण तस्य गृहं प्रविश्य तद्द्रव्यादि लोठयितुं शक्नोति? किन्तु तत् कृत्वा
 तदीयगृहस्य द्रव्यादि लोठयितुं शक्नोति | 30 यः कश्चित् मम स्वपक्षीयो
 नहि स विपक्षीय आस्ते, यश्च मया साकं न संगृह्णाति, स विकिरति | 31
 अतएव युष्मानहं वदामि, मनुजानां सर्वप्रकारपापानां निन्दायाश्च भर्षणं
 भवितुं शक्नोति, किन्तु पवित्रस्यात्मनो विरुद्धनिन्दाया भर्षणं भवितुं न

શકનોતિ | 32 યો મનુજસુતસ્ય વિરુદ્ધાં કથાં કથયતિ, તસ્યાપરાધસ્ય ક્ષમા ભવિતું શકનોતિ, કિન્તુ યઃ કશ્ચિત્ પવિત્રસ્યાત્મનો વિરુદ્ધાં કથાં કથયતિ નેહલોકે ન પ્રેત્ય તસ્યાપરાધસ્ય ક્ષમા ભવિતું શકનોતિ | (aiōn g165) 33 પાદપં યદિ ભદ્રં વદથ, તર્હિ તસ્ય ફલમપિ સાધુ વક્તવ્યં, યદિ ચ પાદપં અસાધું વદથ, તર્હિ તસ્ય ફલમપ્યસાધુ વક્તવ્યં; યતઃ સ્વીયસ્વીયફલેન પાદપઃ પરિચીયતે | 34 રે ભુજગવંશા યૂયમસાધવઃ સન્તઃ કથં સાધુ વાક્યં વક્તું શક્યથ? યસ્માદ્ અન્તઃકરણસ્ય પૂર્ણભાવાનુસારાદ્ વદનાદ્ વયો નિર્ગચ્છતિ | 35 તેન સાધુર્માનવોડન્તઃકરણરૂપાત્ સાધુભાણડાગારાત્ સાધુ દ્રવ્યં નિર્ગમયતિ, અસાધુર્માનુષસ્ત્વસાધુભાણડાગારાદ્ અસાધુવસ્તૂનિ નિર્ગમયતિ | 36 કિન્ત્વહં યુષ્માન્ વદામિ, મનુજા યાવન્ત્યાલસ્યવયાંસિ વદન્તિ, વિચારદિને તદ્દુત્તરમવશ્યં દાતવ્યં, 37 યતસ્ત્વં સ્વીયવયોભિ નિરપરાધઃ સ્વીયવયોભિશ્ચ સાપરાધો ગણિષ્યસે | 38 તદાનીં કતિપયા ઉપાધ્યાયાઃ ફિરૂશિનશ્ચ જગદ્ગુઃ, હે ગુરો વયં ભવન્તઃ કિન્ત્રન લક્ષ્મ દિદક્ષામઃ | 39 તદા સ પ્રત્યુક્તવાન્, દુષ્ટો વ્યભિચારી ચ વંશો લક્ષ્મ મૃગયતે, કિન્તુ ભવિષ્યદ્વાદિનો યૂનસો લક્ષ્મ વિહાયાન્યત્ કિમપિ લક્ષ્મ તે ન પ્રદર્શયિષ્યન્તે | 40 યતો યૂનમ્ યથા ત્ર્યહોરાત્રં બૃહન્મીનસ્ય કુક્ષાવાસીત્, તથા મનુજપુત્રોપિ ત્ર્યહોરાત્રં મેદિન્યા મધ્યે સ્થાસ્યતિ | 41 અપરં નીનિવીયા માનવા વિચારદિન એતદ્વંશીયાનાં પ્રતિકૂલમ્ ઉત્થાય તાન્ દોષિણઃ કરિષ્યન્તિ, યસ્માત્તે યૂનસ ઉપદેશાત્ મનાંસિ પરાવર્તયાન્કિરે, કિન્ત્વત્ર યૂનસોપિ ગુરુતર એક આસ્તે | 42 પુનશ્ચ દક્ષિણદેશીયા રાજ્ઞી વિચારદિન એતદ્વંશીયાનાં પ્રતિકૂલમુત્થાય તાન્ દોષિણઃ કરિષ્યતિ યતઃ સા રાજ્ઞી સુલેમનો વિદ્યાયાઃ કથાં શ્રોતું મેદિન્યાઃ સીમ્ન આગચ્છત્, કિન્તુ સુલેમનોપિ ગુરુતર એકો જનોડત્ર આસ્તે | 43 અપરં મનુજાદ્ બહિર્ગતો ડપવિત્રભૂતઃ શુષ્કસ્થાનેન ગત્વા વિશ્રામં ગવેષયતિ, કિન્તુ તદલભમાનઃ સ વક્તિ, યસ્મા; નિકેતનાદ્ આગમં, તદેવ વેશ્મ પકાવૃત્ય યામિ | 44 પશ્ચાત્ સ તત્ સ્થાનમ્ ઉપસ્થાય તત્ શૂન્યં માજિર્જતં શોભિતત્ર વિલોક્ય પ્રજન્ સ્વતોપિ દુષ્ટતરાન્ અન્યસપ્તભૂતાન્ સક્ષિન્ઃ કરોતિ | 45 તતસ્તે તત્ સ્થાનં પ્રવિશ્ય નિવસન્તિ, તેન તસ્ય મનુજસ્ય શેષદશા પૂર્વદશાતોતીવાશુભા ભવતિ, એતેષાં દુષ્ટવંશ્યાનામપિ તથૈવ ઘટિષ્યતે | 46 માનવેભ્ય એતાસાં કથનાં કથનકાલે તસ્ય માતા

सडजाश्च तेन साकं काञ्चित् कथां कथयितुं वाञ्छन्तो बडिरेव स्थितवन्तः |
 47 ततः कश्चित् तस्मै कथितवान्, पश्य तव जननी सडजाश्च त्वया साकं
 काञ्चन कथां कथयितुं कामयमाना बडिस्तिष्ठन्ति | 48 किन्तु स तं प्रत्यवदत्,
 मम का जननी? के वा मम सडजाः? 49 पश्चात् शिष्यान् प्रति करं
 प्रसार्य कथितवान्, पश्य मम जननी मम सडजाश्चैते; 50 यः कश्चित् मम
 स्वर्गस्थस्य पितुरिष्टं कर्म कुरुते, सञ्चैव मम भ्राता भगिनी जननी य |

13 अपरञ्च तस्मिन् दिने यीशुः सदानो गत्वा सरित्पते रोधसि
 समुपविवेश | 2 तत्र तत्सन्निधौ बडुजनानां निवडोपस्थितेः स
 तरणिमारुह्य समुपाविशत्, तेन मानवा रोधसि स्थितवन्तः | 3 तदानीं स
 दृष्टान्तैस्तान् घट्यं बडुश उपदिष्टवान् | पश्यत, कश्चित् कृषीवलो बीजानि
 वप्तुं बडिर्जगाम, 4 तस्य वपनकाले कतिपयबीजेषु मार्गपार्श्वे पतितेषु
 विडगास्तानि भक्षितवन्तः | 5 अपरं कतिपयबीजेषु स्तोकमृधुकतपाषाणे
 पतितेषु मृदल्पत्वात् तत्क्षणात् तान्यङ्कुरितानि, 6 किन्तु रवावुदिते दग्धानि
 तेषां मूलाप्रविष्टत्वात् शुष्कतां गतानि य | 7 अपरं कतिपयबीजेषु
 कण्टकानां मध्ये पतितेषु कण्टकान्येधित्वा तानि जग्रसुः | 8 अपरञ्च
 कतिपयबीजानि उर्वरायां पतितानि; तेषां मध्ये कानियित् शतगुणानि
 कानियित् षष्टिगुणानि कानियित् त्रिंशदगुणानि इलानि इदितवन्ति | 9 श्रोतुं
 यस्य श्रुती आसाते स शृणुयात् | 10 अनन्तरं शिष्यैरागत्य सोऽपृच्छयत्,
 भवता तेभ्यः कुतो दृष्टान्तकथा कथ्यते? 11 ततः स प्रत्यवदत्, स्वर्गराज्यस्य
 निगूढां कथां वेदितुं युष्मभ्यं सामर्थ्यमदायि, किन्तु तेभ्यो नादायि | 12
 यस्माद् यस्यान्तिके वद्धते, तस्माथेव दायिष्यते, तस्मात् तस्य बाडुल्यं
 भविष्यति, किन्तु यस्यान्तिके न वद्धते, तस्य यत् किञ्चनास्ते, तदपि तस्माद्
 आदायिष्यते | 13 ते पश्यन्तोपि न पश्यन्ति, शृण्वन्तोपि न शृण्वन्ति,
 बुध्यमाना अपि न बुध्यन्ते य, तस्मात् तेभ्यो दृष्टान्तकथा कथ्यते | 14
 यथा कर्णैः श्रोष्यथ यूयं वै किन्तु यूयं न भोत्स्यथ | नेत्रैर्द्रक्ष्यथ यूयञ्च
 परिज्ञातुं न शक्यथ | ते मानुषा यथा नैव परिपश्यन्ति लोचनैः | कर्णै
 र्यथा न शृण्वन्ति न बुध्यन्ते य मानसैः | व्यावर्तितेषु यित्तेषु काले कुत्रापि
 तैर्जनैः | भक्तस्ते मनुजाः स्वस्था यथा नैव भवन्ति य | तथा तेषां मनुष्याणां
 क्रियन्ते स्थूलबुद्धयः | बधिरीभूतकर्णाश्च जाताश्च मुद्रिता दृशः | 15

यदेतानि वयनानि यिशयियभविष्यद्वादिना प्रोक्तानि तेषु तानि इलन्ति।
 16 किन्तु युष्माकं नयनानि धन्यानि, यस्मात् तानि वीक्षन्ते; धन्याश्च
 युष्माकं शब्दग्रहाः, यस्मात् तैराकार्यते। 17 मया यूयं तथ्यं वयाभि
 युष्माभि र्यधद् वीक्ष्यते, तद् भवो भविष्यद्वादिनो धार्मिकाश्च मानवा
 द्विदृक्षन्तोपि द्रष्टुं नालभन्त, पुनश्च यूयं यधत् शृणुथ, तत् ते शुश्रूषमाणा
 अपि श्रोतुं नालभन्त। 18 कृषीवलीयदृष्टान्तस्यार्थं शृणुत। 19 मार्गपार्श्वे
 बीजान्युप्तानि तस्यार्थं अेषः, यदा कश्चित् राज्यस्य कथां निशम्य न
 बुध्यते, तदा पापात्मागत्य तदीयमनस उप्तां कथां हरन् नयति। 20 अपरं
 पाषाणस्थले बीजान्युप्तानि तस्यार्थं अेषः; कश्चित् कथां श्रुत्वैव उर्षयित्तेन
 गृह्णाति, 21 किन्तु तस्य मनसि मूलाप्रविष्टत्वात् स किञ्चित्कालमात्रं
 स्थिरस्तिष्ठति; पश्चात् तत्कथाकारणात् कोपि क्लेस्ताऽन वा येत् जायते,
 तर्हि स तत्क्षणाद् विघ्नमेति। 22 अपरं कण्टकानां मध्ये बीजान्युप्तानि तदर्थं
 अेषः; केनचित् कथायां श्रुतायां सांसारिकयिन्ताभि ब्रान्तिभिश्च सा ग्रस्यते,
 तेन सा मा विह्वला भवति। (aiōn g165) 23 अपरम् उर्वरायां बीजान्युप्तानि
 तदर्थं अेषः; ये तां कथां श्रुत्वा वुध्यन्ते, ते इलिताः सन्तः केचित् शतगुणानि
 केचित् षष्ठिगुणानि केचिच्च त्रिंशद्गुणानि इलानि जनयन्ति। 24 अनन्तरं
 सोपराभेकां दृष्टान्तकथामुपस्थाप्य तेभ्यः कथयामास; स्वर्गीयराज्यं तादृशेन
 केनयिद् गृहस्थेनोपमीयते, येन स्वीयक्षेत्रे प्रशस्तबीजान्यौघ्यन्त। 25 किन्तु
 क्षाण्डायां सकललोकेषु सुप्तेषु तस्य रिपुरागत्य तेषां गोधूमबीजानां मध्ये
 वन्ययवमबीजान्युप्त्वा वव्राज। 26 ततो यदा बीजेभ्योऽङ्कुरा जायमानाः
 कण्डिशानि धृतवन्तः; तदा वन्ययवसान्यपि दृश्यमानान्यभवन्। 27 ततो
 गृहस्थस्य दासेया आगम्य तस्मै कथयाञ्चक्रुः, हे मडेच्छ, भवता किं क्षेत्रे
 भद्रबीजानि नौघ्यन्त? तथात्वे वन्ययवसानि कृत आयन्? 28 तदानीं तेन ते
 प्रतिगदिताः, केनचित् रिपुरा कर्ममकारि। दासेयाः कथयामासुः, वयं गत्वा
 तान्युत्थाप्य क्षिपामो भवतः कीदृशीच्छा जायते? 29 तेनावादि, नहि, शङ्केऽहं
 वन्ययवसोत्पादनकाले युष्माभिस्तैः साकं गोधूमा अप्युत्पाटिष्यन्ते। 30
 अतः शस्यकर्तनकालं यावद् उभयान्यपि सह वर्द्धन्तां, पश्चात् कर्तनकाले
 कर्तकान् वक्ष्यामि, यूयमादौ वन्ययवसानि संगृह्य दाडयितुं वीटिका भद्व्या
 स्थापयत; किन्तु सर्व्वे गोधूमा युष्माभि र्भाण्डागारं नीत्वा स्थाप्यन्ताम्।

31 अनन्तरं सोपराभेकां दृष्टान्तकथामुत्थाप्य तेभ्यः कथितवान् कश्चिन्मनुजः
सर्षपबीजभेकं नीत्वा स्वक्षेत्रे उवाच | 32 सर्षपबीजं सर्वस्माद् बीजात्
क्षुद्रमपि सद्दुस्तरितं सर्वस्मात् शाकात् बृहद् भवति; स तादृशस्तरु भवति,
यस्य शाभासु नभसः भगा आगत्य निवसन्ति; स्वर्गीयराज्यं तादृशस्य
सर्षपैकस्य समम् | 33 पुनरपि स उपमाकथामेकां तेभ्यः कथयाञ्चकार;
कायन योषित् यत् किण्वमादाय द्रोणत्रयमितगोधूमयूर्णानां मध्ये सर्वेषां
मिश्रीभवनपर्यन्तं समाच्छाद्य निधत्तवती, तत्किण्वमिव स्वर्गराज्यं |
34 एत्थं यीशु मनुजनिवहानां सन्निधावुपमाकथामिरेतान्याप्यानानि
कथितवान् उपमां विना तेभ्यः किमपि कथां नाकथयत् | 35 अतेन दृष्टान्तीयेन
वाक्येन व्यादाय वदनं निजं | अहं प्रकाशयिष्यामि गुप्तवाक्यं पुराभवं |
यदेतद्वयनं भविष्यद्वादिना प्रोक्तमासीत्, तत् सिद्धमभवत् | 36 सर्वान्
मनुजान् विसृज्य यीशौ गृहं प्रविष्टे तच्छिष्या आगत्य यीशवे कथितवन्तः,
क्षेत्रस्य वन्यववसीयदृष्टान्तकथाम् भवान् अस्मान् स्पष्टीकृत्य वदतु | 37
ततः स प्रत्युवाच, येन भद्रबीजान्युप्यन्ते स मनुजपुत्रः, 38 क्षेत्रं जगत्,
भद्रबीजानी राज्ञस्य सन्तानाः, 39 वन्यववसानि पापात्मनः सन्तानाः |
येन रिपुणा तान्युप्तानि स शयतानः, कर्त्तनसमयश्च जगतः शेषः, कर्त्तकाः
स्वर्गीयदूताः | (aiōn g165) 40 यथा वन्यववसानि संगृह्य दाह्यन्ते, तथा
जगतः शेषे भविष्यति; (aiōn g165) 41 अर्थात् मनुजसुतः स्वायदूतान्
प्रेषयिष्यति, तेन ते य तस्य राज्यात् सर्वान् विघ्नकारिणोऽधार्मिकलोकांश्च
संगृह्य 42 यत्र रोदनं दन्तघर्षणञ्च भवति, तत्राग्निकुण्डे निक्षेप्यन्ति | 43
तदानीं धार्मिकलोकाः स्वेषां पितॄ राज्ञ्ये भास्करेण तेजस्विनो भविष्यन्ति |
श्रोतुं यस्य श्रुती आसाते, म शृणुयात् | 44 अपरञ्च क्षेत्रमध्ये निर्धिं पश्यन्
यो गोपयति, ततः परं सानन्दो गत्वा स्वीयसर्वस्वं विक्रीय तक्षेत्रं क्रीणाति,
स एव स्वर्गराज्यं | 45 अन्यञ्च यो वणिक् उत्तमां मुक्तां गवेषयन्
46 मडार्घ्यां मुक्तां विलोक्य निजसर्वस्वं विक्रीय तां क्रीणाति, स एव
स्वर्गराज्यं | 47 पुनश्च समुद्रो निक्षिप्तः सर्वप्रकारमीनसंग्राहानायएव
स्वर्गराज्यं | 48 तस्मिन् आनाये पूर्णे जना यथा रोधस्युत्तोल्य समुपविश्य
प्रशस्तमीनान् संग्रह्य भाजनेषु निदधते, कुत्सितान् निक्षिपन्ति; 49 तथैव
जगतः शेषे भविष्यति, इलतः स्वर्गीयदूता आगत्य पुण्यवज्जनानां

मध्यात् पापिनः पृथक् कृत्वा वह्निङ्कुएडे निक्षेप्यन्ति, (aiōn g165) 50
तत्र रोदनं दन्तैर्दन्तघर्षणञ्च भविष्यतः | 51 यीशुना ते पृष्टा युष्माभिः
किमेतान्याभ्यानान्यबुध्यन्त? तदा ते प्रत्यवदन्, सत्यं प्रभो | 52 तदानीं स
कथितवान्, निजभाएडागारात् नवीनपुरातनानि वस्तूनि निर्गमयति यो
गृहस्थः स एव स्वर्गराज्यमधि शिक्षिताः स्वर्व उपदेष्टारः | 53 अनन्तरं
यीशुरेताः सर्व्वा दृष्टान्तकथाः समाप्य तस्मात् स्थानात् प्रतस्थे | अपरं
स्वदेशमागत्य जनान् भजनभवन उपदिष्टवान्; 54 ते विस्मयं गत्वा
कथितवन्त अेतस्यैतादृशं ज्ञानम् आश्चर्य्यं कर्म य कस्माद् अजायत? 55
किमयं सूत्रधारस्य पुत्रो नडि? अेतस्य मातुर्नाम य किं मरियम् नडि? याकुब्-
यूषङ्-शिभोन्-यिडूदाश्च किमेतस्य भ्रातरो नडि? 56 अेतस्य भगिन्यश्च
किमस्माकं मध्ये न सन्ति? तर्हि कस्माद्यमेतानि लब्धवान्? एत्थं स तेषां
विघ्नरूपो भवूव; 57 ततो यीशुना निगदितं स्वदेशीयजनानां मध्यं विना
भविष्यद्वादी कुत्राप्यन्यत्र नासम्मान्यो भवती | 58 तेषामविश्वासहेतोः स
तत्र स्थाने बह्नाश्चर्य्यकर्माणि न कृतवान् |

14 तदानीं राजा डेरोद् यीशो र्यशः श्रुत्वा निजदासेयान् जगाद्, 2
अेष मज्जयिता योडन्, प्रमितेभयस्तस्योत्थानात् तेनेत्थमद्भुतं कर्म
प्रकाशयते | 3 पुरा डेरोद् निजभ्रातुः डिलिपो जायाया डेरोदीयाया अनुरोधाद्
योडनं धारयित्वा बद्धा कारायां स्थापितवान् | 4 यतो योडन् उक्तवान्,
अेतसयाः संग्रहो भवतो नोयितः | 5 तस्मात् नृपतिस्तं डन्तुमिच्छन्नपि
लोकैभ्यो विभयाञ्चकार; यतः सर्व्वे योडनं भविष्यद्वादिनं मेनिरे | 6 किन्तु
डेरोदो जन्माडीयमड उपस्थिते डेरोदीयाया दृडिता तेषां समक्षं नृतित्वा
डेरोदमप्रीएयत् | 7 तस्मात् भूपतिः शपथं कुर्व्वन् एति प्रत्यज्ञासीत्, त्वया
यद् याय्यते, तदेवाडं दास्यामि | 8 सा कुमारी स्वीयमातुः शिक्षां लब्धा
बभाषे, मज्जयितुर्योडन उक्तमाङ्गं भाजने समानीय मह्यं विश्राणय |
9 ततो राजा शुशोच, किन्तु भोजनायोपविशतां सङ्गिनां स्वकृतशपथस्य
यानुरोधात् तत् प्रदातुम आदिदेश | 10 पश्चात् कारां प्रति नरं प्रडित्य
योडन उक्तमाङ्गं छित्वा 11 तत् भाजन आनाय्य तस्यै कुमार्थ्ये व्यश्राणयत्,
ततः सा स्वजनन्याः समीपं तन्निनाय | 12 पश्चात् योडनः शिष्या
आगत्य कायं नीत्वा श्मशाने स्थापयामासुस्ततो यीशोः सन्निधिं व्रजित्वा

તદ્વાર્તા બભાષિરે | 13 અનન્તરં યીશુરિતિ નિશભ્ય નાવા નિર્જનસ્થાનમ્
 એકાકી ગતવાન, પશ્ચાત્ માનવાસ્તત્ શ્રુત્વા નાનાનગરેભ્ય આગત્ય
 પદૈસ્તત્પશ્ચાદ્ ઇયુઃ | 14 તદાનીં યીશુ બહિરાગત્ય મહાન્તં જનનિવહં
 નિરીક્ષ્ય તેષુ કારુણિકઃ મન્ તેષાં પીડિતજનાન્ નિરામયાન્ ચકાર | 15
 તતઃ પરં સન્ધ્યાયાં શિષ્યાસ્તદન્તિકમાગત્ય કથયાઞ્ચક્રુઃ, ઇદં નિર્જનસ્થાનં
 વેલાપ્યવસન્ના; તસ્માત્ મનુજાન્ સ્વસ્વગ્રામં ગન્તું સ્વાર્થ ભક્ષ્યાણિ કેતુઞ્ચ
 ભવાન્ તાન્ વિસૃજતુ | 16 કિન્તુ યીશુસ્તાનવાદીત્, તેષાં ગમને પ્રયોજનં
 નાસ્તિ, યૂયમેવ તાન્ ભોજયત | 17 તદા તે પ્રત્યવદન્, અસ્માકમત્ર
 પૂપપન્નકં મીનદ્વયઞ્ચાસ્તે | 18 તદાનીં તેનોક્તં તાનિ મદન્તિકમાનયત |
 19 અનન્તરં સ મનુજાન્ યવસોપર્યુપવેષ્ટુમ્ આજ્ઞાપયામાસ; અપર તત્
 પૂપપન્નકં મીનદ્વયઞ્ચ ગૃહ્ણન્ સ્વર્ગ પ્રતિ નિરીક્ષ્યેશ્વરીયગુણાન્ અનૂઘ ભંક્ત્વા
 શિષ્યેભ્યો દત્તવાન્, શિષ્યાશ્ચ લોકેભ્યો દદુઃ | 20 તતઃ સર્વે ભુક્ત્વા
 પરિતૃપ્તવન્તઃ, તતસ્તદવશિષ્ટભક્ષ્યેઃ પૂર્ણાન્ દ્વાદશડલકાન્ ગૃહીતવન્તઃ |
 21 તે ભોક્તારઃ સ્ત્રીર્બાલકાંશ્ચ વિહાય પ્રાયેણ પન્ન સહસ્રાણિ પુમાંસ
 આસન્ | 22 તદનન્તરં યીશુ લોકાનાં વિસર્જનકાલે શિષ્યાન્ તરણિમારોહું
 સ્વાગ્રે પારં યાતુઞ્ચ ગાઢમાદિષ્ટવાન્ | 23 તતો લોકેષુ વિસૃષ્ટેષુ સ વિવિક્તે
 પ્રાર્થયિતું ગિરિમેકં ગત્વા સન્ધ્યાં યાવત્ તત્રૈકાકી સ્થિતવાન્ | 24 કિન્તુ
 તદાનીં સમ્મુખવાતવાત્ સરિત્પતે મધ્યે તરઙ્ગેસ્તરણિર્દોલાયમાનાભવત્ |
 25 તદા સ યામિન્યાશ્ચતુર્થપ્રહરે પદ્ભ્યાં વ્રજન્ તેષામન્તિકં ગતવાન્ | 26
 કિન્તુ શિષ્યાસ્તં સાગરોપરિ વ્રજન્તં વિલોક્ય સમુદ્વિગ્ના જગદુઃ, એષ
 ભૂત ઇતિ શક્ટમાના ઉચ્ચૈઃ શબ્દાયાઞ્ચક્રિરે ચ | 27 તદૈવ યીશુસ્તાનવદત્,
 સુસ્થિરા ભવત, મા ભૈષ્ટ, એષોડહમ્ | 28 તતઃ પિતર ઇત્યુક્તવાન્, હે
 પ્રભો, યદિ ભવાનેવ, તર્હિ માં ભવત્સમીપં યાતુમાજ્ઞાપયતુ | 29 તતઃ
 તેનાદિષ્ટઃ પિતરસ્તરણિતોડવરુહ્ય યીશેરન્તિકં પ્રાપ્તું તોયોપરિ વપ્રાજ | 30
 કિન્તુ પ્રચણ્ડં પવનં વિલોક્ય ભયાત્ તોયે મંક્તુમ્ આરેભે, તસ્માદ્ ઉચ્ચૈઃ
 શબ્દાયમાનઃ કથિતવાન્, હે પ્રભો, મામવતુ | 31 યીશુસ્તત્ક્ષણાત્ કરં
 પ્રસાર્થ્ય તં ધરન્ ઉક્તવાન્, હ સ્તોકપ્રત્યયિન્ ત્વં કુતઃ સમશેથા? 32
 અનન્તરં તયોસ્તરણિમારુઢયોઃ પવનો નિવવૃતે | 33 તદાનીં યે તરણ્યામાસન્,
 ત આગત્ય તં પ્રણભ્ય કથિતવન્તઃ, યથાર્થસ્ત્વમેવેશ્વરસુતઃ | 34 અનન્તરં

पारं प्राप्य ते गिनेषरन्नामकं नगरमुपतस्थुः, 35 तदा तत्रत्या जना यीशुं
परिचीय तद्देशस्य यतुर्दिशो वार्तां प्रहित्य यत्र यावन्तः पीडिता आसन्,
तावतमेव तदन्तिकमानयामासुः। 36 अपरं तदीयवसनस्य ग्रन्थिमात्रं स्प्रष्टुं
विनीय यावन्तो जनास्तत् स्पर्शं यच्छिरे, ते सर्व्वमेव निरामया बभूवुः।

15 अपरं यिज्ञासाम् नगरीयाः कतिपया अध्यापकाः द्विज्ञानश्च यीशोः
समीपमागत्य कथयामासुः, 2 तव शिष्याः किमर्थम् अप्रक्षालितकरैर्भक्षित्वा
परम्परागतं प्राचीनानां व्यवहारं लङ्घन्ते? 3 ततो यीशुः प्रत्युवाच, यूयं
परम्परागतायारेण कुत ईश्वराज्ञां लङ्घये। 4 ईश्वर इत्याज्ञापयत्, त्वं
निजपितरौ संमन्येथाः, येन य निजपितरौ निन्देते, स निश्चितं म्रियेत; 5
किन्तु यूयं वदथ, यः स्वजनकं स्वजननीं वा वाक्यमिदं वदति, युवां भक्तो
यत्नमेधे, तत् न्यविधत्, 6 स निजपितरौ पुनर्न संमंस्यते। इत्थं यूयं
परम्परागतेन स्वेषामायारेणेश्वरीयाज्ञां लुम्पथ। 7 रे कपटिनः सर्व्वे
यिश्चियो युष्मानधि भविष्यद्वयनान्येतानि सम्यग् उक्तवान्। 8 वदनै
र्भनुजा अते समायान्ति मदनिकं। तथाधरैर्भदीयञ्च मानं कुर्वन्ति ते नराः।
9 किन्तु तेषां मनो भक्तो विदूरमेव तिष्ठति। शिक्षयन्तो विधीन् त्राज्ञा भजन्ते
मां मुधैव ते। 10 ततो यीशु लोकां आहूय प्रोक्तवान्, यूयं श्रुत्वा बुध्यध्वं।
11 यन्मुष्मं प्रविशति, तत् मनुजम् अमेध्यं न करोति, किन्तु यदास्यात्
निर्गच्छति, तदेव मानुषममेधी करोती। 12 तदानीं शिष्या आगत्य
तस्मै कथयाञ्चुः, अंतां कथां श्रुत्वा द्विज्ञानो व्यरज्यन्त, तत् किं भवता
ज्ञायते? 13 स प्रत्यवदत्, मम स्वर्गस्थः पिता यं कञ्चिदङ्कुरं नारोपयत्,
स उत्पाद्यते। 14 ते तिष्ठन्तु, ते अन्धमनुजानाम् अन्धमार्गदर्शका अवे;
यद्यन्धोऽन्धं पन्थानं दर्शयति, तर्ह्युभौ गर्ते पततः। 15 तदा पितरस्तं
प्रत्यवदत्, दृष्टान्तमिममस्मान् बोधयतु। 16 यीशुना प्रोक्तं, यूयमध यावत्
किमबोधाः स्थ? 17 कथामिमां किं न बुध्यध्वे? यदास्यं प्रविशति, तद्
उदरे पतन् बहिर्निर्याति, 18 किन्त्वास्याद् यन्निर्याति, तद् अन्तःकरणात्
निर्यातत्वात् मनुजममेध्यं करोति। 19 यतोऽन्तःकरणात् कुयिन्ता अधः
पारदारिकता वेश्यागमनं यैर्य्य मिथ्यासाक्ष्यम् ईश्वरनिन्दा यैतानि सर्वाणि
निर्यान्ति। 20 अेतानि मनुष्यमपवित्री कुर्वन्ति किन्त्वप्रक्षालितकरेण
भोजनं मनुजममेध्यं न करोति। 21 अनन्तरं यीशुस्तस्मात् स्थानात् प्रस्थाय

સોરસીદોનનગરયોઃ સીમામુપતસ્યૌ | 22 તદા તત્સીમાતઃ કાચિત્ કિનાનીયા
 યોષિદ્ આગત્ય તમુચ્ચૈરુવાય, હે પ્રભો દાયુદઃ સન્તાન, મમૈકા દુહિતાસ્તે
 સા ભૂતગ્રસ્તા સતી મહાકલેશં પ્રાપ્નોતિ મમ દયસ્વ | 23 કિન્તુ યીશુસ્તાં
 કિમપિ નોક્તવાન્, તતઃ શિષ્યા આગત્ય તં નિવેદયામાસુઃ, ઓષા યોષિદ્
 અસ્માકં પશ્ચાદ્ ઉચ્ચૈરાહૂયાગચ્છતિ, એનાં વિસૃજતુ | 24 તદા સ પ્રત્યવદત્,
 ઇસ્રાયેલ્વોત્રસ્ય હારિતમેષાન્ વિના કસ્યાપ્યન્યસ્ય સમીપં નાહં પ્રેષિતોસ્મિ |
 25 તતઃ સા નારીસમાગત્ય તં પ્રણમ્ય જગાદ, હે પ્રભો મામુપકુરુ | 26
 સ ઉક્તવાન્, બાલકાનાં ભક્ષ્યમાદાય સારમેયેભ્યો દાનં નોચિતં | 27
 તદા સા બભાષે, હે પ્રભો, તત્ સત્યં, તથાપિ પ્રભો ભ્રમ્યાદ્ યદુચ્છિષ્ટં
 પતતિ, તત્ સારમેયાઃ ખાદન્તિ | 28 તતો યીશુઃ પ્રત્યવદત્, હે યોષિત્, તવ
 વિશ્વાસો મહાન્ તસ્માત્ તવ મનોભિલપિતં સિદ્ધ્યતુ, તેન તસ્યાઃ કન્યા
 તસ્મિન્નેવ દાડે નિરામયાભવત્ | 29 અનન્તરં યીશસ્તસ્માત્ સ્થાનાત્
 પ્રસ્થાય ગાલીલ્સાગરસ્ય સન્નિધિમાગત્ય ધરાધરમારુહ્ય તત્રોપવિવેશ | 30
 પશ્ચાત્ જનનિવહો બહૂન્ ખત્રાન્ધમૂકશુષ્કરમાનુષાન્ આદાય યીશોઃ
 સમીપમાગત્ય તચ્ચરણાન્તિકે સ્થાપયામાસુઃ, તતઃ સા તાન્ નિરામયાન્
 અકરોત્ | 31 ઇત્યં મૂકા વાક્યં વદન્તિ, શુષ્કરાઃ સ્વાસ્થ્યમાયાન્તિ, પદ્મવો
 ગચ્છન્તિ, અન્ધા વીક્ષન્તે, ઇતિ વિલોક્ય લોકા વિસ્મયં મન્યમાના ઇસ્રાયેલ
 ઇશ્વરં ધન્યં બભાષિરે | 32 તદાનીં યીશુઃ સ્વશિષ્યાન્ આહૂય ગદિતવાન્,
 એતજ્જનનિવહેષુ મમ દયા જાયતે, એતે દિનત્રયં મયા સાકં સન્તિ, એષાં
 ભક્ષ્યવસ્તુ ય કચ્છિદપિ નાસ્તિ, તસ્માદહમેતાનકૃતાહારાન્ ન વિસ્રક્ષ્યામિ,
 તથાત્વે વર્તમધ્યે કલામ્યેષુઃ | 33 તદા શિષ્યા ઊચુઃ, એતસ્મિન્ પ્રાન્તરમધ્ય
 એતાવતો મર્ત્યાન્ તર્પયિતું વયં કુત્ર પૂપાન્ પ્રાપ્સ્યામઃ? 34 યીશુરપૃચ્છત્,
 યુષ્માકં નિકટે કતિ પૂપા આસતે? ત ઊચુઃ, સપ્તપૂપા અલ્પાઃ ક્ષુદ્રમીનાશ્ચ
 સન્તિ | 35 તદાનીં સ લોકનિવહં ભૂમાવુપવેષ્ટુમ્ આદિશ્ય 36 તાન્ સપ્તપૂપાન્
 મીનાંશ્ચ ગૃહ્ણન્ ઇશ્વરીયગુણાન્ અનૂઘ ભંકત્વા શિષ્યેભ્યો દદૌ, શિષ્યા
 લોકેભ્યો દદુઃ | 37 તતઃ સર્વે ભુક્ત્વા તૃપ્તવન્તઃ; તદવશિષ્ટભક્ષ્યેણ
 સપ્તડલકાન્ પરિપૂર્ય સંજગુહુઃ | 38 તે ભોક્તારો યોષિતો બાલકાંશ્ચ
 વિહાય પ્રાયેણ ચતુઃસહસ્રાણિ પુરુષા આસન્ | 39 તતઃ પરં સ જનનિવહં
 વિસૃજ્ય તરિમારુહ્ય મગ્દલાપ્રદેશં ગતવાન્ |

16 तदानीं द्विःशिनः सिद्धकिनागत्तं तं परीक्षितुं नभमीयं किञ्चन लक्ष्म
दर्शयितुं तस्मै निवेदयामासुः | 2 ततः स उक्तवान्, सन्ध्यायां नभसो
रक्तत्वाद् यूयं वदथ, श्वो निर्मलं दिनं भविष्यति; 3 प्रातःकाले य नभसो
रक्तत्वात् मलिनत्वाच्च वदथ, ऋत्तशय भविष्यति | 4 कपटिनो यदि यूयम्
अन्तरीक्षस्य लक्ष्म ओद्धुं शक्नुथ, तर्हि कालस्यैतस्य लक्ष्म कथं ओद्धुं न
शक्नुथ? 4 अतत्कालस्य दृष्टो व्यभियारी य वंशो लक्ष्म गवेषयति, किन्तु
यूनसो भविष्यद्वादिनो लक्ष्म विनान्यत् किमपि लक्ष्म तान् न दर्शयिष्यते |
तदानीं स तान् विहाय प्रतस्थे | 5 अनन्तरमन्यपारगमनकाले तस्य
शिष्याः पूषमानेतुं विस्मृतवन्तः | 6 यीशुस्तानवादीत्, यूयं द्विःशिनां
सिद्धकिनाञ्च कि एवं प्रति सावधानाः सतर्काश्च भवत | 7 तेन ते परस्परं
विविष्य कथयितुमारेभिरे, वयं पूषानानेतुं विस्मृतवन्त अतत्कारणाद् एति
कथयति | 8 किन्तु यीशुस्तद्विज्ञाय तानवोयत्, 9 स्तोत्रविश्वासिनो यूयं
पूषानानयनमधि कुतः परस्परमेतद् विविष्य? 9 युष्माभिः किमधापि न
ज्ञायते? पञ्चभिः पूषैः पञ्चसहस्रपुरुषेषु भोजितेषु लक्ष्योच्छिष्टपूरान्
कति ऽलकान् समगृह्णीतं; 10 तथा सप्तभिः पूषैश्चतुःसहस्रपुरुषेषु भोजितेषु
कति ऽलकान् समगृह्णीत, तत् किं युष्माभिर्न स्मर्यते? 11 तस्मात्
द्विःशिनां सिद्धकिनाञ्च कि एवं प्रति सावधानास्तिष्ठत, कथामिमाम् अहं
पूषानधि नाकथयं, अतद् यूयं कुतो न बुध्यध्वे? 12 तदानीं पूषकि एवं
प्रति सावधानास्तिष्ठतेति नोक्त्वा द्विःशिनां सिद्धकिनाञ्च उपदेशं प्रति
सावधानास्तिष्ठतेति कथितवान्, एति तैरबोधि | 13 अपरञ्च यीशुः
कैसरिया-द्विःशिपिप्रदेशमागत्य शिष्यान् अपृच्छत्, योऽहं मनुजसुतः
सोऽहं कः? लोकेऽहं किमुच्ये? 14 तदानीं ते कथितवन्तः, केचिद् वदन्ति
त्वं मञ्जयिता योऽहं, केचिद्वदन्ति, त्वम् ओलियः, केचिच्च वदन्ति, त्वं
थिरिमियो वा कश्चिद् भविष्यद्वादीति | 15 पश्चात् स तान् पप्रच्छ, यूयं मां
कं वदथ? ततः शिमोन् पितर उवाच, 16 त्वमभरेश्वरस्याभिषिक्तपुत्रः |
17 ततो यीशुः कथितवान्, 18 हे यूनसः पुत्र शिमोन् त्वं धन्यः; यतः कोपि
अनुजस्त्वय्येतज्ज्ञानं नोदपाद्यत्, किन्तु मम स्वर्गस्यः पितोदपाद्यत् | 18
अतोऽहं त्वां वदामि, त्वं पितरः (प्रस्तरः) अहञ्च तस्य प्रस्तरस्योपरि
स्वभाएऽलीं निर्मास्यामि, तेन निरयो बलात् तां पराजितुं न शक्यति |

(Hadēs g86) 19 अहं तुभ्यं स्वर्गीयराज्यस्य कुञ्जिकां दास्यामि, तेन यत् किञ्चन त्वं पृथिव्यां भन्त्यसि तत्स्वर्गे भन्त्यते, यच्च किञ्चन मद्यां भोक्ष्यसि तत् स्वर्गे भोक्ष्यते। 20 पश्चात् स शिष्यानादिशतु, अहमभिषिक्तो यीशुरिति कथां कस्मैयिदपि यूयं मा कथयत। 21 अन्यञ्च यिज्ञुशालभनगरं गत्वा प्राचीनलोकेभ्यः प्रधानयाजकेभ्य उपाध्यायेभ्यश्च बहुदुःखभोगस्तैर्लतत्वं तृतीयदिने पुनरुत्थानञ्च ममावश्यकम् अताः कथा यीशुस्तत्कालमारभ्य शिष्यान् ज्ञापयितुम् आरब्धवान्। 22 तदानीं पितरस्तस्य करं धृत्वा तर्जयित्वा कथयितुमारब्धवान्, हे प्रभो, तत् त्वत्तो हूरं यातु, त्वां प्रति कदापि न घटिष्यते। 23 किन्तु स वदनं परावर्त्य पितरं जगाद, हे विघ्नकारिन्, मत्सम्भुभाद् दूरीभव, त्वं मां बाधसे, ईश्वरीयकार्यात् मानुषीयकार्यं तुभ्यं रोयते। 24 अनन्तरं यीशुः स्वीयशिष्यान् उक्तवान् यः कश्चित् मम पश्चाद्गामी भवितुम् ईच्छति, स स्वं दाभ्यतु, तथा स्वकुशं गृह्णन् मत्पश्चादायातु। 25 यतो यः प्राणान् रक्षितुमिच्छति, स तान् हारयिष्यति, किन्तु यो मर्धं निजप्राणान् हारयति, स तान् प्राप्स्यति। 26 मानुषो यदि सर्व्वं जगत् लभते निजप्राणान् हारयति, तर्हि तस्य को लाभः? मनुजो निजप्राणानां विनिमयेन वा किं दातुं शक्नोति? 27 मनुजसुतः स्वदूतैः साकं पितुः प्रभावेणागमिष्यति; तदा प्रतिमनुजं स्वस्वकर्मानुसारात् कुलं दास्यति। 28 अहं युष्मान् तथ्यं वञ्चि, सराज्यं मनुजसुतम् आगतं न पश्यन्तो मृत्युं न स्वादिष्यन्ति, अतादृशाः कतिपयजना अत्रापि दाडायमानाः सन्ति।

17 अनन्तरं षड्दिनेभ्यः परं यीशुः पितरं याकूबं तत्सङ्गं योहनञ्च गृह्णन् उच्यते विविक्तस्थानम् आगत्य तेषां समक्षं उपमन्यत् दधार। 2 तेन तदास्यं तेजस्वि, तदाभराणाम् आलोकवत् पाण्डरमभवत्। 3 अन्यच्च तेन साकं संलपन्तौ भूसा अलियश्च तेभ्यो दर्शनं ददतुः। 4 तदानीं पितरो यीशुं जगाद, हे प्रभो स्थितिरत्रास्माकं शुभा, यदि भवतानुमन्यते, तर्हि भवदर्थमेकं भूसार्थमेकम् अलियार्थञ्चैकम् धति त्रीणि दूष्याणि निर्म्मम। 5 अतत्कथनकाले एक उज्जवलः पयोदस्तेषामुपरि छायां कृतवान्, वारिदाद् अेषा नभसीया वाग् बभूव, ममायं प्रियः पुत्रः, अस्मिन् मम मडासन्तोष अेतस्य वाक्यं यूयं निशाभयत। 6 किन्तु वायभेतां शृण्वन्तमेव शिष्या

મૃશં શક્રમાના ન્યુબ્જા ન્યપતન્ | 7 તદા યીશુરાગત્ય તેષાં ગાત્રાણિ
 સ્પૃશન્ ઉવાચ, ઉત્તિષ્ઠત, મા ભૈષ્ટ | 8 તદાનીં નેત્રાણ્યુન્મીલ્ય યીશું
 વિના કમપિ ન દદૃશુઃ | 9 તતઃ પરમ્ અદ્રેરવરોહણકાલે યીશુસ્તાન્
 ઇત્યાદિદેશ, મનુજસુતસ્ય મૃતાનાં મધ્યાદુત્થાનં યાવન્ જાયતે, તાવત્
 યુષ્માભિરેતદર્શનં કર્મૈચિદપિ ન કથયિતવ્યં | 10 તદા શિષ્યાસ્તં પપ્રચ્છુઃ,
 પ્રથમમ્ એલિય આયાસ્યતીતિ કુત ઉપાધ્યાયૈરુચ્યતે? 11 તતો યીશુઃ
 પ્રત્યવાદીતુ, એલિયઃ પ્રાગેત્ય સર્વાણિ સાધયિષ્યતીતિ સત્યં, 12 કિન્ત્વહં
 યુષ્માન્ વચ્મિ, એલિય એત્ય ગતઃ, તે તમપરિચિત્ય તસ્મિન્ યથેચ્છં
 વ્યવજહુઃ; મનુજસુતેનાપિ તેષામન્તિકે તાદૃગ્ દુઃખં ભોક્તવ્યં | 13 તદાનીં સ
 મજ્જયિતારં યોહનમધિ કથામેતાં વ્યાહતવાન્, ઇત્યં તચ્છિષ્યા બુબુધિરે |
 14 પશ્ચાત્ તેષુ જનનિવહસ્યાન્તિકમાગતેષુ કશ્ચિત્ મનુજસ્તદન્તિકમેત્ય
 જાનૂની પાતયિત્વા કથિતવાન્, 15 હે પ્રભો, મત્પુત્રં પ્રતિ કૃપાં વિદધાતુ,
 સોપસ્મારામયેન ભૃશં વ્યથિતઃ સન્ પુનઃ પુન વહ્નૌ મુહુર્જલમધ્યે પતતિ |
 16 તસ્માદ્ ભવતઃ શિષ્યાણાં સમીપે તમાનયં કિન્તુ તે તં સ્વાસ્થ્યં કર્તુ ન
 શક્તાઃ | 17 તદા યીશુઃ કથિતવાન્ રે અવિશ્વાસિનઃ, રે વિપથગામિનઃ,
 પુનઃ કતિકાલાન્ અહં યુષ્માકં સન્નિઘૌ સ્થાસ્યામિ? કતિકાલાન્ વા યુષ્માન્
 સહિષ્યે? તમત્ર મમાન્તિકમાનયત | 18 પશ્ચાદ્ યીશુના તર્જતએવ સ ભૂતસ્તં
 વિહાય ગતવાન્, તદ્દણ્ડએવ સ બાલકો નિરામયોડભૂત | 19 તતઃ શિષ્યા
 ગુપ્તં યીશુમુપાગત્ય બભાષિરે, કુતો વયં તં ભૂતં ત્યાજયિતું ન શક્તાઃ? 20
 યીશુના તે પ્રોક્તાઃ, યુષ્માકમપ્રત્યયાતઃ 21 યુષ્માનહં તથ્યં વચ્મિ યદિ યુષ્માકં
 સર્ષપૈકમાત્રોપિ વિશ્વાસો જાયતે, તર્હિ યુષ્માભિરસ્મિન્ શૈલે ત્વમિતઃ
 સ્થાનાત્ તત્ સ્થાનં યાહીતિ બ્રૂતે સ તદૈવ ચલિષ્યતિ, યુષ્માકં કિમપ્યસાધ્યઞ્ચ
 કર્મ્મ ન સ્થાસ્યાતિ | કિન્તુ પ્રાર્થનોપવાસૌ વિનૈતાદૃશો ભૂતો ન ત્યાજ્યેત | 22
 અપરં તેષાં ગાલીલ્પ્રદેશે ભ્રમણકાલે યીશુના તે ગદિતાઃ, મનુજસુતો જનાનાં
 કરેષુ સમર્પયિષ્યતે તૈ હંનિષ્યતે ચ, 23 કિન્તુ તૃતીયેડહિન મ ઉત્થાપિષ્યતે,
 તેન તે ભૃશં દુઃખિતા બભૂવઃ | 24 તદનન્તરં તેષુ કફર્નાહૂમ્નગરમાગતેષુ
 કરસંગ્રાહિણઃ પિતરાન્તિકમાગત્ય પપ્રચ્છુઃ, યુષ્માકં ગુરુઃ કિં મન્દિરાર્થં કરં ન
 દદાતિ? તતઃ પિતરઃ કથિતવાન્ દદાતિ | 25 તતસ્તસ્મિન્ ગૃહમધ્યમાગતે
 તસ્ય કથાકથનાત્ પૂર્વમેવ યીશુરુવાચ, હે શિમોન્, મેદિન્યા રાજાનઃ

स्वस्वापत्येभ्यः किं विदेशिभ्यः केभ्यः करं गृह्णन्ति? अत्र त्वं किं बुध्यसे?
ततः पितर उक्तवान्, विदेशिभ्यः | 26 तदा यीशुरुक्तवान्, तर्हि सन्ताना
मुक्ताः सन्ति | 27 तथापि यथास्माभिस्तेषामन्तरायो न जन्यते, तत्कृते
जलधेस्तीरं गत्वा वडिशं क्षिप, तेनाद्यै यो मीन उत्थास्यति, तं धृत्वा
तन्मुभे मोयिते तोलकैकं रुप्यं प्राप्स्यसि, तद् गृहीत्वा तव मम य कृते तेभ्यो
देहि |

18 तदानीं शिष्या यीशोः समीपमागत्य पृष्टवन्तः स्वर्गराज्ये कः श्रेष्ठः?
2 ततो यीशुः क्षुद्रमेकं बालकं स्वसमीपमानीय तेषां मध्ये निधाय जगाद,
3 युष्मानदं सत्यं ब्रवीमि, यूयं मनोविनिमयेन क्षुद्रबालवत् न सन्तः
स्वर्गराज्यं प्रवेष्टुं न शक्नुथ | 4 यः कश्चिद् अेतस्य क्षुद्रबालकस्य
सममात्मानं नम्रीकरोति, सअेव स्वर्गराज्ये श्रेष्ठः | 5 यः कश्चिद् अेतादृशं
क्षुद्रबालकमेकं मम नाम्नि गृह्णाति, स माभेव गृह्णाति | 6 किन्तु यो जनो
मयि कृतविश्वासानामेतेषां क्षुद्रप्राणिनाम् अेकस्यापि विघ्नं जनयति,
कण्ठबद्धपेषणीकस्य तस्य सागरागाधजले मज्जनं श्रेयः | 7 विघ्नात्
जगतः सन्तापो भविष्यति, विघ्नोऽवश्यं जनयिष्यते, किन्तु येन मनुजेन
विघ्नो जनिष्यते तस्यैव सन्तापो भविष्यति | 8 तस्मात् तव करश्चरणो
वा यदि त्वां बाधते, तर्हि तं छित्त्वा निक्षिप, द्विकरस्य द्विपदस्य वा
तवानप्तवह्नौ निक्षेपात्, भञ्जस्य वा छिन्नहस्तस्य तव ज्वने प्रवेशो वरं |
(aĩōnios g166) 9 अपरं तव नेत्रं यदि त्वां बाधते, तर्हि तदप्युत्पाव्य निक्षिप,
द्विनेत्रस्य नरकाग्नौ निक्षेपात् काणस्य तव ज्वने प्रवेशो वरं | (Geenna
g1067) 10 तस्मादवधद्धं, अेतेषां क्षुद्रप्राणिनाम् अेकमपि मा तुच्छीकुरुत,
11 यतो युष्मानदं तथ्यं ब्रवीमि, स्वर्गे तेषां दूता मम स्वर्गस्थस्य पितुरास्यं
नित्यं पश्यन्ति | अेवं ये ये हारितास्तान् रक्षितुं मनुजपुत्र आगच्छत् | 12
यूयमत्र किं विविग्ध्वे? कस्यचिद् यदि शतं मेषाः सन्ति, तेषामेको हार्यते य,
तर्हि स अेकोनशतं मेषान् विहाय पर्वतं गत्वा तं हारितमेकं किं न भृगयते?
13 यदि य कदाचित् तन्भेषोद्देशं लभते, तर्हि युष्मानदं सत्यं कथयामि,
सोऽविपथगामिभ्य अेकोनशतमेषेभ्योपि तदेकदेतोरधिकम् आह्लादते |
14 तद्गद् अेतेषां क्षुद्रप्राणेनाम् अेकोपि नश्यतीति युष्माकं स्वर्गस्थपितु
र्नाभिमतम् | 15 यद्यपि तव भ्राता त्वयि किमप्यपराध्यति, तर्हि गत्वा

युवयोर्द्वयोः स्थितयोस्तस्यापराधं तं ज्ञापय | तत्र स यदि तव वाक्यं
शृणोति, तर्हि त्वं स्वभ्रातरं प्राप्तवान्, 16 किन्तु यदि न शृणोति, तर्हि
द्वाभ्यां त्रिभिर्वा साक्षीभिः सर्व्वं वाक्यं यथा निश्चितं जायते, तदर्थम् अेकं
द्वौ वा साक्षिणौ गृहीत्वा याहि | 17 तेन स यदि तयोर्वाक्यं न मान्यते,
तर्हि समाजं तज्ज्ञापय, किन्तु यदि समाजस्यापि वाक्यं न मान्यते, तर्हि स
तव समीपे देवपूजकथं च यत्कालं च भविष्यति | 18 अहं युष्मान् सत्यं
वदामि, युष्माभिः पृथिव्यां यद् बध्यते तत् स्वर्गं भन्त्यते; भेदिन्यां यत्
भोष्यते, स्वर्गोऽपि तत् भोक्ष्यते | 19 पुनरहं युष्मान् वदामि, भेदिन्यां युष्माकं
यदि द्वावेकवाक्यीभूय किञ्चित् प्रार्थयेते, तर्हि मम स्वर्गस्थपित्रा तत् तयोः कृते
सम्पन्नं भविष्यति | 20 यतो यत्र द्वौ त्रयो वा मम नान्नि मिलन्ति, तत्रैवाहं
तेषां मध्येऽस्मि | 21 तदानीं पितरस्तत्समीपमागत्य कथितवान् हे प्रभो,
मम भ्राता मम यथापराध्यति, तर्हि तं कति कृत्वः क्षमिष्ये? 22 किं सप्तकृत्वः?
यीशुस्तं जगाद, त्वां केवलं सप्तकृत्यो यावत् न वदामि, किन्तु सप्तत्या
गुणितं सप्तकृत्यो यावत् | 23 अपरं निजदासैः सह जिगाणयिषुः कश्चिद्
राजैव स्वर्गराज्यं | 24 आरब्धे तस्मिन् गाणने सार्द्धसहस्रमुद्रापुरितानां
दशसहस्रपुटकानाम् अेकोऽघमर्णस्तत्समक्षमानायि | 25 तस्य परिशोधनाय
द्रव्याभावात् परिशोधनार्थं स तदीयभार्यापुत्रादिसर्व्वस्वञ्च विक्रीयतामिति
तत्रभुरादिदेश | 26 तेन स दासस्तस्य पादयोः पतन् प्रणम्य कथितवान्,
हे प्रभो भवता धैर्य्यं कृते मया सर्व्वं परिशोधिष्यते | 27 तदानीं दासस्य
प्रभुः सकरुणः सन् सकलार्णं क्षमित्वा तं तत्याज | 28 किन्तु तस्मिन्
दासे बहि र्यति, तस्य शतं मुद्रायतुर्थाशान् यो धारयति, तं सहदासं
दृष्ट्वा तस्य कण्ठं निष्पीड्य गदितवान्, मम यत् प्राप्यं तत् परिशोधय |
29 तदा तस्य सहदासस्तत्यादयोः पतित्वा विनीय बभाषे, त्वया धैर्य्यं
कृते मया सर्व्वं परिशोधिष्यते | 30 तथापि स तत् नाऽगीकृत्य यावत्
सर्व्वभृणं न परिशोधितवान् तावत् तं कारायां स्थापयामास | 31 तदा
तस्य सहदासास्तस्यैतादृग् आयरणं विलोक्य प्रभोः समीपं गत्वा सर्व्वं
वृत्तान्तं निवेदयामासुः | 32 तदा तस्य प्रभुस्तमाडूय जगाद, रे दुष्ट दास,
त्वया मत्सन्निधौ प्रार्थिते मया तव सर्व्वभृणं त्यक्तं; 33 यथा चाहं त्वयि
करुणां कृतवान्, तथैव त्वत्सहदासे करुणाकरणं किं तव नोचितं? 34 एति

कथयित्वा तस्य प्रभुः कुट्टयन् निजप्राप्यं यावत् स न परिशोधितवान्,
 तावत् प्रहारकानां करेषु तं समर्पितवान्। 35 यद्वि यूयं स्वान्तःकराणैः
 स्वस्वसङ्गानाम् अपराधान् न क्षमध्वे, तर्हि मम स्वर्गस्यः पितापि युष्मान्
 प्रतीत्यं करिष्यति।

19 अनन्तरम् अतासु कथासु समाप्तासु यीशु गर्गीलप्रदेशात् प्रस्थाय
 यर्दनीरस्थं यिडूदाप्रदेशं प्राप्तः। 2 तदा तत्पश्चात् जननिवले गते स
 तत्र तान् निराभयान् अकरोत्। 3 तदनन्तरं डिउशिनस्तत्समीपमागत्य
 पारीक्षितुं तं पप्रच्छः, कस्मादपि कारणात् नरेण स्वजाया परित्याज्या
 न वा? 4 स प्रत्युवाच, प्रथमम् ईश्वरो नरत्वेन नारीत्वेन य मनुजान्
 ससर्ज, तस्मात् कथितवान्, 5 मानुषः स्वपितरौ परित्यज्य स्वपत्न्याम्
 आसक्ष्यते, तौ द्वौ जनावेकाङ्गौ भविष्यतः, किमेतद् युष्माभिर्न पठितम्?
 6 अतस्तौ पुनर्न द्वौ तयोरेकाङ्गत्वं ज्ञातं, ईश्वरेण यच्च समयुज्यत,
 मनुजो न तद् भिन्धात्। 7 तदानीं ते तं प्रत्यवदन्, तथात्वे त्याज्यपत्रं
 दत्त्वा स्वां स्वां जायां त्यक्तुं व्यवस्थां भूसाः कथं विलोभ? 8 ततः स
 कथितवान्, युष्माकं मनसां काठिन्याद् युष्मान् स्वां स्वां जायां त्यक्तुम्
 अन्वमन्यत किन्तु प्रथमाद् अेषो विधिर्नासीत्। 9 अतो युष्मानलं वदामि,
 व्यभियारं विना यो निजजायां त्यजेत् अन्यात्र विवलेत्, स परदारान्
 गच्छति; यच्च त्यक्तां नारीं विवलेति सोऽपि परदारेषु रभते। 10 तदा
 तस्य शिष्यास्तं बभाषिरे, यद्वि स्वजायया साकं पुंस अतादृक् सम्बन्धो
 जायते, तर्हि विवहनमेव न भद्रं। 11 ततः स उक्तवान्, येभ्यस्तत्सामर्थ्यं
 आदायि, तान् विनान्यः कोऽपि मनुज अतन्मतं ग्रहीतुं न शक्नोति। 12
 कतिपया जनकलीभः कतिपया नरकृतकलीभः स्वर्गराज्याय कतिपयाः
 स्वकृतकलीभाश्च सन्ति, ये ग्रहीतुं शक्नुवन्ति ते गृह्णन्तु। 13 अपरम्
 यथा स शिशूनां गात्रेषु हस्तं दत्त्वा प्रार्थयते, तदर्थं तत्समीपं शिशव
 आनीयन्त, तत आनयितुं शिष्यास्तिरस्कृतवन्तः। 14 किन्तु यीशुरुवाच,
 शिशवो भदन्तिकम् आगच्छन्तु, तान् मा वारयत, अतादृशां शिशूनामेव
 स्वर्गराज्यं। 15 ततः स तेषां गात्रेषु हस्तं दत्त्वा तस्मात् स्थानात् प्रतस्थे।
 16 अपरम् अेक आगत्य तं पप्रच्छ, हे परमगुरो, अनन्तायुः प्राप्तुं मया
 किं किं सत्कर्म कर्तव्यं? (aiōnios g166) 17 ततः स उवाच, मां परमं

કુતો વદસિ? વિનેશ્ચરં ન કોપિ પરમઃ, કિન્તુ યદનન્તાયુઃ પ્રાપ્તું વાઞ્છસિ,
તદર્હાઙ્ગાઃ પાલય | 18 તદા સ પૃષ્ઠવાન્, કાઃ કા આઙ્ગાઃ? તતો યીશુઃ
કથિતવાન્, નરં મા હન્યાઃ, પરદારાન્ મા ગચ્છેઃ, મા ચોરયેઃ, મૃષાસાક્ષ્યં મા
દધાઃ, 19 નિજપિતરૌ સંમન્યસ્વ, સ્વસમીપવાસિનિ સ્વવત્ પ્રેમ કુરુ | 20 સ
યુવા કથિતવાન્, આ બાલ્યાદ્ એતાઃ પાલયામિ, ઇદાનીં કિં ન્યૂનમાસ્તે? 21
તતો યીશુરવદત્, યદિ સિદ્ધો ભવિતું વાઞ્છસિ, તર્હિ ગત્વા નિજસર્વસ્વં
વિક્રીય દરિદ્રેભ્યો વિતર, તતઃ સ્વર્ગે વિત્તં લપ્સ્યસે; આગચ્છ, મત્પશ્ચાદ્ધર્ત્વી
ય ભવ | 22 એતાં વાયં શ્રુત્વા સ યુવા સ્વીયબહુસમ્પત્તે વિષણઃ સન્
ચલિતવાન્ | 23 તદા યીશુઃ સ્વશિષ્યાન્ અવદત્, ધનિનાં સ્વર્ગરાજ્યપ્રવેશો
મહાદુષ્કર ઇતિ યુષ્માનહં તથ્યં વદામિ | 24 પુનરપિ યુષ્માનહં વદામિ,
ધનિનાં સ્વર્ગરાજ્યપ્રવેશાત્ સૂચીછિદ્રેણ મહાઙ્ગમનં સુકરં | 25 ઇતિ વાક્યં
નિશમ્ય શિષ્યા અતિયમત્કૃત્ય કથયામાસુઃ; તર્હિ કસ્ય પરિત્રાણં ભવિતું
શક્નોતિ? 26 તદા સ તાન્ દૃષ્ટ્વા કથયામાસ, તત્ માનુષાણામશક્યં ભવતિ,
કિન્ત્વીશ્વરસ્ય સર્વં શક્યમ્ | 27 તદા પિતરસ્તં ગદિતવાન્, પશ્ય, વયં
સર્વં પરિત્યજ્ય ભવતઃ પશ્ચાદ્ધર્ત્તિનો ડભવામઃ; વયં કિં પ્રાપ્સ્યામઃ? 28 તતો
યીશુઃ કથિતવાન્, યુષ્માનહં તથ્યં વદામિ, યૂયં મમ પશ્ચાદ્ધર્ત્તિનો જાતા ઇતિ
કારણાત્ નવીનસૃષ્ટિકાલે યદા મનુજસુતઃ સ્વીયેશ્ચર્યસિંહાસન ઉપવેક્ષ્યતિ,
તદા યૂયમપિ દ્વાદશસિંહાસનેષૂપવિશ્ય ઇસ્રાયેલીયદ્વાદશવંશાનાં વિચારં
કરિષ્યથ | 29 અન્યચ્ચ યઃ કશ્ચિત્ મમ નામકારણાત્ ગૃહં વા ભ્રાતરં વા
ભગિનીં વા પિતરં વા માતરં વા જાયાં વા બાલકં વા ભૂમિં પરિત્યજતિ, સ
તેષાં શતગુણં લપ્સ્યતે, અનન્તાયુમોઽધિકારિત્વઞ્ચ પ્રાપ્સ્યતિ | (aiōnios
g166) 30 કિન્તુ અગ્રીયા અનેકે જનાઃ પશ્ચાત્, પશ્ચાતીયાશ્ચાનેકે લોકા અગ્રે
ભવિષ્યન્તિ |

20 સ્વર્ગરાજ્યમ્ એતાદૃશા કેનચિદ્ ગૃહસ્થેન સમં, ચોડતિપ્રભાતે
નિજદ્રાક્ષાક્ષેત્રે કૃષકાન્ નિયોક્તું ગતવાન્ | 2 પશ્ચાત્ તેઃ સાકં દિનૈકભૃતિં
મુદ્રાયતુર્થાશં નિરૂપ્ય તાન્ દ્રાક્ષાક્ષેત્રં પ્રેરયામાસ | 3 અનન્તરં પ્રહરૈકવેલાયાં
ગત્વા હટ્ટે કતિપયાન્ નિષ્કર્મકાન્ વિલોક્ય તાનવદત્, 4 યૂયમપિ મમ
દ્રાક્ષાક્ષેત્રં યાત, યુષ્મભ્યમહં યોગ્યભૃતિં દાસ્યામિ, તતસ્તે વવ્રજુઃ | 5
પુનશ્ચ સ દ્વિતીયતૃતીયયોઃ પ્રહરયો ભહિ ગત્વા તથૈવ કૃતવાન્ | 6 તતો

દાડદ્વયાવશિષ્ટાયાં વેલાયાં બહિર્ગત્વાપરાન્ કતિપયજનાન્ નિષ્કર્મકાન્
 વિલોક્ય પૃષ્ઠવાન્, યૂયં કિમર્થમ્ અત્ર સર્વ્વં દિનં નિષ્કર્માણસ્તિષ્ઠથ? 7
 તે પ્રત્યવદન્, અસ્માન્ ન કોપિ કર્મમણિ નિયુંકતે | તદાનીં સ કથિતવાન્,
 યૂયમપિ મમ દ્રાક્ષાક્ષેત્રં યાત, તેન યોગ્યાં ભૃતિં લપ્સ્યથ | 8 તદનન્તરં
 સન્ધ્યાયાં સત્યાં સએવ દ્રાક્ષાક્ષેત્રપતિરધ્યક્ષં ગદિવાન્, કૃષકાન્ આહૂય
 શેષજનમારભ્ય પ્રથમં યાવત્ તેભ્યો ભૃતિં દેહિ | 9 તેન યે દાડદ્વયાવસ્થિતે
 સમાયાતાસ્તેષામ્ એકૈકો જનો મુદ્રાયતુર્થાંશં પ્રાપ્નોત્ | 10 તદાનીં
 પ્રથમનિયુક્તા જના આગત્યાનુમિતવન્તો વયમધિકં પ્રપ્સ્યામઃ, કિન્તુ તૈરપિ
 મુદ્રાયતુર્થાંશોડલાભિ | 11 તતસ્તે તં ગૃહીત્વા તેન ક્ષેત્રપતિના સાકં વાગ્યુદ્ધં
 કુર્વન્તઃ કથયામાસુઃ, 12 વયં કૃત્સ્નં દિનં તાપકલેશૌ સોઢવન્તઃ, કિન્તુ
 પશ્ચાતાયા સે જના દાડદ્વયમાત્રં પરિશ્રાન્તવન્તસ્તેડસ્માભિઃ સમાનાંશાઃ
 કૃતાઃ | 13 તતઃ સ તેષામેકં પ્રત્યુવાય, હે વત્સ, મયા ત્વાં પ્રતિ કોપ્યન્ચાયો
 ન કૃતઃ કિં ત્વયા મત્સમક્ષં મુદ્રાયતુર્થાંશો નાઙ્ગીકૃતઃ? 14 તસ્માત્ તવ
 યત્ પ્રાપ્યં તદાદાય યાહિ, તુભ્યં યતિ, પશ્ચાતીયનિયુક્તલોકાયાપિ તતિ
 દાતુમિચ્છામિ | 15 સ્વેચ્છયા નિજદ્રવ્યવ્યવહરણં કિં મયા ન કર્તવ્યં?
 મમ દાતૃત્વાત્ ત્વયા કિમ્ ઈર્ષ્યાદૃષ્ટિઃ કિયતે? 16 ઇત્યમ્ અગ્રીયલોકાઃ
 પશ્ચાતીયા ભવિષ્યન્તિ, પશ્ચાતીયજનાશ્ચગ્રીયા ભવિષ્યન્તિ, અહૂતા બહવઃ
 કિન્તવત્પે મનોભિલષિતાઃ | 17 તદનન્તરં યીશુ ચિરૂશાલમ્નગરં ગચ્છન્
 માર્ગમધ્યે શિષ્યાન્ એકાન્તે વભાષે, 18 પશ્ય વયં ચિરૂશાલમ્નગરં યામઃ,
 તત્ર પ્રધાનયાજકાધ્યાપકાનાં કરેષુ મનુષ્યાપુત્રઃ સમર્પિષ્યતે; 19 તે ય તં
 હન્તુમાજ્ઞાપ્ય તિરસ્કૃત્ય વેત્રેણ પ્રહર્તુ કુશે ધાતયિતુઞ્ચાન્યદેશીયાનાં કરેષુ
 સમર્પયિષ્યન્તિ, કિન્તુ સ તૃતીયદિવસે શ્મશાનાદ્ ઉત્થાપિષ્યતે | 20 તદાનીં
 સિવદીયસ્ય નારી સ્વપુત્રાવાદાય યીશોઃ સમીપમ્ એત્ય પ્રણમ્ય કઞ્ચનાનુગ્રહં
 તં યયાયે | 21 તદા યીશુસ્તાં પ્રોક્તવાન્, ત્વં કિં યાયસે? તતઃ સા બભાષે,
 ભવતો રાજત્વે મમાનયોઃ સુતયોરેકં ભવદ્દક્ષિણાપાશર્વે દ્વિતીયં વામપાશર્વ
 ઉપવેષ્ટુમ્ આજ્ઞાપયતુ | 22 યીશુઃ પ્રત્યુવાય, યુવાભ્યાં યદ્ યાચ્યતે, તન્ન
 બુધ્યતે, અહં યેન કંસેન પાસ્યામિ યુવાભ્યાં કિં તેન પાતું શક્યતે? અહઞ્ચ
 યેન મજ્જેનેન મજ્જિષ્યે, યુવાભ્યાં કિં તેન મજ્જયિતું શક્યતે? તે જગદુઃ
 શક્યતે | 23 તદા સ ઉક્તવાન્, યુવાં મમ કંસેનાવશ્યં પાસ્યથઃ, મમ

મજજનેન ચ યુવામપિ મજ્જિજ્જ્યેથે, કિન્તુ યેષાં કૃતે મત્તાતેન નિરૂપિતમ્
 ઇદં તાન્ વિહયાન્યં કમપિ મદક્ષિણાપાર્શ્વે વામપાર્શ્વે ચ સમુપવેશયિતું
 મમાધિકારો નાસ્તિ | 24 એતાં કથાં શ્રુત્વાન્યે દશશિષ્યાસ્તૌ ભ્રાતરૌ પ્રતિ
 યુક્તુપુ | 25 કિન્તુ યીશુઃ સ્વસમીપં તાનાહૂય જગાદ, અન્યદેશીયલોકાનાં
 નરપતયસ્તાન્ અધિકુર્વ્વન્તિ, યે તુ મહાન્તસ્તે તાન્ શાસતિ, ઇતિ યૂયં
 જાનીથ | 26 કિન્તુ યુષ્માકં મધ્યે ન તથા ભવેત્, યુષ્માકં યઃ કશ્ચિત્ મહાન્
 બુભૂષતિ, સ યુષ્માન્ સેવેત; 27 યશ્ચ યુષ્માકં મધ્યે મુખ્યો બુભૂષતિ,
 સ યુષ્માકં દાસો ભવેત્ | 28 ઇત્યં મનુજપુત્રઃ સેવ્યો ભવિતું નહિ, કિન્તુ
 સેવિતું બહૂનાં પરિત્રાણમૂલ્યાર્થં સ્વપ્રાણાન્ દાતુઞ્ચાગતઃ | 29 અનન્તરં
 યિરીહોનગરાત્ તેષાં બહિર્ગમનસમયે તસ્ય પશ્ચાદ્ બહવો લોકા વપ્રજુઃ |
 30 અપરં વર્ત્મપાર્શ્વ ઉપવિશન્તૌ દ્વાવન્ધૌ તેન માર્ગેણ યીશો ગર્મનં નિશમ્ય
 પ્રોચ્યૈઃ કથયામાસતુઃ, હે પ્રભો દાયૂદઃ સન્તાન, આવયો દયાં વિધેહિ | 31
 તતો લોકાઃ સર્વે તુષ્ટીભવતમિત્યુક્ત્વા તૌ તર્જયામાસુઃ; તથાપિ તૌ
 પુનરુચ્યૈઃ કથયામાસતુઃ હે પ્રભો દાયૂદઃ સન્તાન, આવાં દયસ્વ | 32 તદાનીં
 યીશુઃ સ્થગિતઃ સન્ તાવાહૂય ભાષિતવાન્, યુવયોઃ કૃતે મયા કિં કર્તવ્યં?
 યુવાં કિં કામયેથે? 33 તદા તાવુક્તવન્તૌ, પ્રભો નેત્રાણિ નૌ પ્રસન્નાનિ
 ભવેયુઃ | 34 તદાનીં યીશુસ્તૌ પ્રતિ પ્રમન્નઃ સન્ તયો નેત્રાણિ પસ્પર્શ, તેનૈવ
 તૌ સુવીક્ષાઞ્ચક્રાતે તત્પશ્ચાત્ જગ્મુતુશ્ચ |

21 અનન્તરં તેષુ યિરૂશાલમ્નગરસ્ય સમીપવેર્તિનો જૈતુનનામકધરાધરસ્ય
 સમીપસ્થિતં બૈલ્કુગિગ્રામમ્ આગતેષુ, યીશુઃ શિષ્યદ્વયં પ્રેષયન્ જગાદ, 2
 યુવાં સમ્મુખસ્થગ્રામં ગત્વા બદ્ધાં યાં સવત્સાં ગર્દભીં હઠાત્ પ્રાપ્સ્યથઃ, તાં
 મોચયિત્વા મદન્તિકમ્ આનયતં | 3 તત્ર યદિ કશ્ચિત્ કિઞ્ચિદ્ વક્ષ્યતિ, તર્હિ
 વદિષ્યથઃ, એતસ્યાં પ્રભોઃ પ્રયોજનમાસ્તે, તેન સ તત્ક્ષણાત્ પ્રહેષ્યતિ |
 4 સીયોનઃ કન્યકાં યૂયં ભાષધ્વમિતિ ભારતીં | પશ્ય તે નમ્રશીલઃ સન્
 નૃપ આરુહ્ય ગર્દભીં | અર્થાદારુહ્ય તદ્વત્સમાયાસ્યતિ ત્વદન્તિકં | 5
 ભવિષ્યદ્વાદિનોક્તં વચનમિદં તદા સફલમભૂત્ | 6 અનન્તરં તૌ શિષ્ય યીશો
 ર્થથાનિદેશં તં ગ્રામં ગત્વા 7 ગર્દભીં તદ્વત્સઞ્ચ સમાનીતવન્તૌ, પશ્ચાત્
 તદુપરિ સ્વીયવસનાની પાતયિત્વા તમારોહયામાસતુઃ | 8 તતો બહવો લોકા
 નિજવસનાનિ પથિ પ્રસારયિતુમારેભિરે, કતિપયા જનાશ્ચ પાદપપર્ણાદિકં

છિત્વા પથિ વિસ્તારયામાસુઃ | 9 અગ્રગામિનઃ પશ્ચાદ્ગામિનશ્ચ મનુજા
 ઉચ્ચૈર્જય જય દાયૂદઃ સન્તાનેતિ જગદુઃ પરમેશ્વરસ્ય નામ્ના ય આયાતિ
 સ ધન્યઃ, સર્વોપરિસ્થસ્વર્ગોપિ જયતિ | 10 ઇત્યં તસ્મિન્ ચિરૂશાલમં
 પ્રવિષ્ટે કોડયમિતિ કથનાત્ કૃત્સ્નં નગરં ચત્રલમભવત્ | 11 તત્ર લોકોઃ
 કથયામાસુઃ, એષ ગાલીલ્પ્રદેશીય-નાસરતીય-ભવિષ્યદ્વાદી યીશુઃ | 12
 અનન્તરં યીશુરીશ્વરસ્ય મન્દિરં પ્રવિશ્ય તન્મધ્યાત્ ક્યવિક્રયિણો વહિશ્રકારઃ;
 વણિજાં મુદ્રાસનાની કપોતવિક્રયિણાઞ્ચસનાની ચ ન્યુજ્યામાસ | 13 અપરં
 તાનુવાચ, એષા લિપિરાસ્તે, "મમ ગૃહં પ્રાર્થનાગૃહમિતિ વિખ્યાસ્યતિ", કિન્તુ
 યૂયં તદ્ દસ્યૂનાં ગહ્નરં કૃતવન્તઃ | 14 તદનન્તરમ્ અન્ધખત્રલોકાસ્તસ્ય
 સમીપમાગતાઃ, સ તાન્ નિરામયાન્ કૃતવાન્ | 15 યદા પ્રધાનયાજકા
 અધ્યાપકાશ્ચ તેન કૃતાન્યેતાનિ ચિત્રકર્માણિ દદૃશુઃ, જય જય દાયૂદઃ
 સન્તાન, મન્દિરે બાલકાનામ્ એતાદૃશમ્ ઉચ્યધ્વનિં શુશ્રુવુશ્ચ, તદા મહાકુદ્ધા
 બભૂવઃ, 16 તં પપ્રચ્છુશ્ચ, ઇમે યદ્ વદન્તિ, તત્ કિં ત્વં શૃણોષિ? તતો
 યીશુસ્તાન્ અવોચત્, સત્યમ્; સ્તન્યપાયિશિશૂનાઞ્ચ બાલકાનાઞ્ચ વક્ત્રતઃ |
 સ્વકીયં મહિમાનં ત્વં સંપ્રકાશયસિ સ્વયં | એતદ્વાક્યં યૂયં કિં નાપઠત? 17
 તતસ્તાન્ વિહાય સ નગરાદ્ બૈથનિયાગ્રામં ગત્વા તત્ર રજનીં યાપયામાસ |
 18 અનન્તરં પ્રભાતે સતિ યીશુઃ પુનરપિ નગરમાગચ્છન્ ક્ષુધાર્તો બભૂવ | 19
 તતો માર્ગપાર્શ્વ ઉડુમ્બરવૃક્ષમેકં વિલોક્ય તત્સમીપં ગત્વા પત્રાણિ વિના
 કિમપિ ન પ્રાપ્ય તં પાદપં પ્રોવાચ, અધારભ્ય કદાપિ ત્વયિ ફલં ન ભવતુઃ
 તેન તત્ક્ષણાત્ સ ઉડુમ્બરમાહીરુહઃ શુષ્કતાં ગતઃ | (aiōn g165) 20 તદ્
 દૃષ્ટ્વા શિષ્યા આશ્ચર્યં વિજ્ઞાય કથયામાસુઃ, આઃ, ઉડુમ્બરપાદપોડતિતૂર્ણ
 શુષ્કોડભવત્ | 21 તતો યીશુસ્તાનુવાચ, યુષ્માનહં સત્યં વદામિ, યદિ
 યૂયમસન્દિગ્ધાઃ પ્રતીથ, તર્હિ યૂયમપિ કેવલોડુમ્બરપાદપં પ્રતીત્યં કર્તું શક્ષ્યથ,
 તન્ન, ત્વં ચલિત્વા સાગરે પતેતિ વાક્યં યુષ્માભિરસ્મિન શૈલે પ્રોક્તેપિ
 તદૈવ તદ્ ઘટિષ્યતે | 22 તથા વિશ્વસ્ય પ્રાર્થ્ય યુષ્માભિર્યદ્ યાયિષ્યતે,
 તદૈવ પ્રાપ્સ્યતે | 23 અનન્તરં મન્દિરં પ્રવિશ્યોપદેશનસમયે તત્સમીપં
 પ્રધાનયાજકાઃ પ્રાચીનલોકાશ્રાગત્ય પપ્રચ્છુઃ, ત્વયા કેન સામર્થ્યનૈતાનિ
 કર્માણિ ક્રિયન્તે? કેન વા તુભ્યમેતાનિ સામર્થ્યાનિ દત્તાનિ? 24 તતો
 યીશુઃ પ્રત્યવદત્, અહમપિ યુષ્માન્ વાયમેકાં પૃચ્છામિ, યદિ યૂયં તદ્દત્તરં

दातुं शक्यथ, तदा केन सामर्थ्येन कर्माण्येतानि करोमि, तदहं युष्मान्
 वक्ष्यामि। 25 योऽनो भज्जनं कस्याज्ञायामवत्? किमीश्वरस्य मनुष्यस्य
 वा? ततस्ते परस्परं विविच्य कथयामासुः, यदीश्वरस्येति वदामस्तर्हि
 यूयं तं कुतो न प्रत्यैत? वायमेतां वक्ष्यति। 26 मनुष्यस्येति वक्तुमपि
 लोकेभ्यो ब्रिह्मीमः, यतः सर्वैरपि योऽनू भविष्यद्वादीति ज्ञायते। 27
 तस्मात् ते यीशुं प्रत्यवदन्, तद् वयं न विदमः। तदा स तानुक्तवान्, तर्हि केन
 सामर्थ्येन कर्माण्येतान्यहं करोमि, तदप्यहं युष्मान् न वक्ष्यामि। 28
 कस्ययिज्जनस्य द्वौ सुतावास्तां स अेकस्य सुतस्य समीपं गत्वा जगाद्,
 हे सुत, त्वमथ मम द्राक्षाक्षेत्रे कर्म कर्तुं व्रज। 29 ततः स उक्तवान्,
 न यास्यामि, किन्तु शेषेऽनुत्पद्य जगाम। 30 अनन्तरं सोन्यसुतस्य
 समीपं गत्वा तथैव कथितवान्; ततः स प्रत्युवाच, महेच्छ यामि, किन्तु न
 गतः। 31 अेतयोः पुत्रयो र्मध्ये पितुरभिमतं केन पालितं? युष्माभिः किं
 बुध्यते? ततस्ते प्रत्यूयुः, प्रथमेन पुत्रेण। तदानीं यीशुस्तानुवाच, अहं
 युष्मान् तथ्यं वदामि, यद्दाला गणिकाश्च युष्माकमग्रत ईश्वरस्य राज्यं
 प्रविशन्ति। 32 यतो युष्माकं समीपं योऽनि धर्मपथेनागते यूयं तं न
 प्रतीथ, किन्तु यद्दाला गणिकाश्च तं प्रत्यायन्, तद् विलोक्यापि यूयं प्रत्येतुं
 नापिधध्वं। 33 अपरमेकं दृष्टान्तं शृणुत, कश्चिद् गृहस्थः क्षेत्रे द्राक्षालता
 रोपयित्वा तस्यतुर्दिक्षु वारणीं विधाय तन्मध्ये द्राक्षायन्त्रं स्थापितवान्,
 माञ्ज्र निर्मितवान्, ततः कृषकेषु तत् क्षेत्रं समर्थं स्वयं दूरदेशं जगाम।
 34 तदनन्तरं इलसमय उपस्थिते स इलानि प्राप्तुं कृषीवलानां समीपं
 निजदासान् प्रेषयामास। 35 किन्तु कृषीवलास्तस्य तान् दासेयान् धृत्वा
 कञ्चन प्रहतवन्तः, कञ्चन पाषाणैराहतवन्तः, कञ्चन य अहतवन्तः। 36
 पुनरपि स प्रभुः प्रथमतोऽधिकदासेयान् प्रेषयामास, किन्तु ते तान् प्रत्यपि
 तथैव यक्रुः। 37 अनन्तरं मम सुते गते तं समादरिष्यन्ते, एत्युक्त्वा
 शेषे स निजसुतं तेषां सन्निधिं प्रेषयामास। 38 किन्तु ते कृषीवलाः सुतं
 वीक्ष्य परस्परम् एति मन्त्रयितुम् आरेभिरे, अयमुत्तराधिकारी वयमेनं
 निहत्यास्याधिकारं स्ववशीकरिष्यामः। 39 पश्चात् ते तं धृत्वा द्राक्षाक्षेत्राद्
 बहिः पातयित्वाभधिषुः। 40 यदा स द्राक्षाक्षेत्रपतिरागमिष्यति, तदा
 तान् कृषीवलान् किं करिष्यति? 41 ततस्ते प्रत्यवदन्, तान् कलुषिणो

दारुणयातनाभिराडनिष्यति, ये य समयानुकृमात् इलानि दास्यन्ति,
तादृशेषु कृषीवलेषु क्षेत्रं समर्पयिष्यति। 42 तदा यीशुना ते गदिताः,
ग्रहणं न कृतं यस्य पाषाणस्य नियायकैः। प्रधानप्रस्तरः कोणो सभवेव
संभविष्यति। अतत् परेशितुः कर्मास्मदृष्टावद्भुतं भवेत्। धर्मग्रन्थे
लिखितमेतद्वयं युष्माभिः किं नापाठि? 43 तस्मादहं युष्मान् वदामि,
युष्मत्त एश्वरीयराज्यमपनीय इलोत्पाद्यित्रन्यजातये दायिष्यते। 44 यो
जन अतत्पाषाणोपरि पतिष्यति, तं स भंक्ष्यते, किन्त्वयं पाषाणो यस्योपरि
पतिष्यति, तं स धूलिवत् यूर्णीकरिष्यति। 45 तदानीं प्राधनयाजकाः
द्विश्चिन्तयन् तस्येमां दृष्टान्तकथां श्रुत्वा सोऽस्मानुद्दिश्य कथितवान्, एति
विज्ञाय तं धर्तुं येष्टितवन्तः; 46 किन्तु लोकेभ्यो बिभ्युः, यतो लोकैः स
भविष्यद्वादीत्यज्ञायि।

22 अनन्तरं यीशुः पुनरपि दृष्टान्तेन तान् अवादीत्, 2 स्वर्गीयराज्यम्
अेतादृशस्य नृपतेः समं, यो निज पुत्रं विवाहयन् सर्वान् निमन्त्रितान्
आनेतुं दासेयान् प्रहितवान्, 3 किन्तु ते समागतुं नेष्टवन्तः। 4 ततो
राजा पुनरपि दासानन्यान् एत्युक्त्वा प्रेषयामास, निमन्त्रितान् वदत,
पश्यत, मम भोज्यमासादितमास्ते, निजवृषादिपुष्टजन्तून् मारयित्वा सर्वं
भाधद्रव्यमासादितवान्, यूयं विवाहमागच्छत। 5 तथपि ते तुच्छीकृत्य
केचित् निजक्षेत्रं केचिद् वाणिज्यं प्रति स्वस्वमार्गोण यलितवन्तः। 6
अन्ये लोकास्तस्य दासेयान् धृत्वा दौरात्म्यं व्यवहृत्य तानवधिषुः। 7
अनन्तरं स नृपतिस्तां वार्तां श्रुत्वा क्रुध्यन् सैन्यानि प्रहित्य तान् घातकान्
हत्वा तेषां नगरं दाहयामास। 8 ततः स निजदासेयान् बलाघे, विवाहीयं
भोज्यमासादितमास्ते, किन्तु निमन्त्रिता जना अयोग्याः। 9 तस्माद् यूयं
राजमार्गं गत्वा यावतो मनुजान् पश्यत, तावतभवेव विवाहीयभोज्याय
निमन्त्रयत। 10 तदा ते दासेया राजमार्गं गत्वा भद्रान् अभाद्रान् वा
यावतो जनान् दृशुः, तावतभवेव संगृह्णानयन्; ततोऽभ्यागतमनुजै
र्विवाहगृहम् अपूर्यत। 11 तदानीं स राजा सर्वानभ्यागतान् द्रष्टुम्
अभ्यन्तरमागतवान्; तदा तत्र विवाहीयवसनहीनमेकं जनं वीक्ष्य तं जगाद्,
12 हे मित्र, त्वं विवाहीयवसनं विना कथमत्र प्रविष्टवान्? तेन स निरुत्तरो
भूव। 13 तदा राजा निजानुचरान् अवदत्, अेतस्य कर्यरणान् बद्धा

યત્ર રોદનં દન્તૈર્દન્તઘર્ષણઞ્ચ ભવતિ, તત્ર વહિર્ભૂતતમિસ્રે તં નિક્ષિપત | 14
 ઇત્યં બહવ આહૂતા અલ્પે મનોભિમતાઃ | 15 અનન્તરં ક્ષિરુશિનઃ પ્રગત્ય
 યથા સંલાપેન તમ્ ઉન્માથે પાતયેયુસ્તથા મન્ત્રયિત્વા 16 હેરોદીયમનુજૈઃ
 સાકં નિજશિષ્યગણેન તં પ્રતિ કથયામાસુઃ, હે ગુરો, ભવાન્ સત્યઃ
 સત્યમીશ્વરીયમાર્ગમુપદિશતિ, કમપિ માનુષં નાનુરુઘ્યતે, કમપિ નાપેક્ષતે
 ચ, તદ્ વયં જાનીમઃ | 17 અતઃ કૈસરભૂપાય કરોડસ્માકં દાતવ્યો ન વા?
 અત્ર ભવતા કિં બુઘ્યતે? તદ્ અસ્માન્ વદતુ | 18 તતો યીશુસ્તેષાં ખલતાં
 વિજ્ઞાય કથિતવાન્, રે કપટિનઃ યુયં કુતો માં પરિક્ષધ્વે? 19 તત્કરદાનસ્ય
 મુદ્રાં માં દર્શયત | તદાનીં તૈસ્તસ્ય સમીપં મુદ્રાયતુર્થભાગ આનીતે 20 સ તાન્
 પપ્રચ્છ, અત્ર કસ્યેયં મૂર્તિં નામ યાસ્તે? તે જગદુઃ, કૈસરભૂપસ્ય | 21 તતઃ
 સ ઉક્તવાન્, કૈસરસ્ય યત્ તત્ કૈસરાય દત્ત, ઈશ્વરસ્ય યત્ તદ્ ઈશ્વરાય
 દત્ત | 22 ઇતિ વાક્યં નિશમ્ય તે વિસ્મયં વિજ્ઞાય તં વિહાય ચલિતવન્તઃ |
 23 તસ્મિન્નહનિ સિદ્ધકિનોડર્થાત્ શ્મશાનાત્ નોત્યાસ્યન્તીતિ વાક્યં યે
 વદન્તિ, તે યીશેરન્તિકમ્ આગત્ય પપ્રચ્છુઃ, 24 હે ગુરો, કશ્ચિન્મનુજશ્ચેત્
 નિઃસન્તાનઃ સન્ પ્રાણાન્ ત્યજતિ, તર્હિ તસ્ય ભ્રાતા તસ્ય જાયાં વ્યુદ્ય
 ભ્રાતુઃ સન્તાનમ્ ઉત્પાદયિષ્યતીતિ મૂસા આદિષ્ટવાન્ | 25 કિન્ત્વસ્માકમત્ર
 કેડપિ જનાઃ સપ્તસહોદરા આસન્, તેષાં જ્યેષ્ઠ એકાં કન્યાં વ્યવહાત્, અપરં
 પ્રાણાત્યાગકાલે સ્વયં નિઃસન્તાનઃ સન્ તાં સ્ત્રિયં સ્વભ્રાતરિ સમર્પિતવાન્,
 26 તતો દ્વિતીયાદિસપ્તમાન્તાશ્ચ તથૈવ યદુઃ | 27 શેષે સાપી નારી મમાર |
 28 મૃતાનામ્ ઉત્થાનસમયે તેષાં સપ્તાનાં મધ્યે સા નારી કસ્ય ભાર્યા
 ભવિષ્યતિ? યસ્માત્ સર્વ્યએવ તાં વ્યવહન્ | 29 તતો યીશુઃ પ્રત્યવાદીત્, યૂયં
 ધર્મપુસ્તકમ્ ઈશ્વરીયાં શક્તિઞ્ચ ન વિજ્ઞાય ભ્રાન્તિમન્તઃ | 30 ઉત્થાનપ્રાપ્તા
 લોકા ન વિવહન્તિ, ન ચ વાચા દીયન્તે, કિન્ત્વીશ્વરસ્ય સ્વર્ગસ્થદૂતાનાં
 સદૃશા ભવન્તિ | 31 અપરં મૃતાનામુત્થાનમધિ યુષ્માન્ પ્રતીયમીશ્વરોક્તિઃ,
 32 "અહમિબ્રાહીમ ઈશ્વર ઇસ્હાક ઈશ્વરો યાકૂબ ઈશ્વર" ઇતિ કિં યુષ્માભિ
 નાંપાઠિ? કિન્ત્વીશ્વરો જીવતામ્ ઈશ્વરઃ, સ મૃતાનામીશ્વરો નહિ | 33 ઇતિ
 શ્રુત્વા સર્વ્યે લોકાસ્તસ્યોપદેશાદ્ વિસ્મયં ગતાઃ | 34 અનન્તરં સિદ્ધકિનામ્
 નિરુત્તરત્વવાર્તાં નિશમ્ય ક્ષિરુશિન એકત્ર મિલિતવન્તઃ, 35 તેષામેકો
 વ્યવસ્થાપકો યીશું પરીક્ષિતું પપચ્છ, 36 હે ગુરો વ્યવસ્થાશાસ્ત્રમધ્યે કાજ્ઞા

श्रेष्ठा? 37 ततो यीशुरुवाय, त्वं सर्वान्तःकरणैः सर्वप्राणैः सर्वचित्तैश्च साकं प्रभौ परमेश्वरे प्रीयस्व, 38 ओषा प्रथममडाजा। तस्याः सदृशी द्वितीयाज्ञैषा, 39 तव समीपवासिनि स्वात्मनीव प्रेम कुरु। 40 अनयो द्वयोरज्ञायोः कृत्स्नव्यवस्थाया भविष्यद्भक्तग्रन्थस्य च भारस्तिष्ठति। 41 अनन्तरं द्विज्ञानाम् अत्र स्थितिकाले यीशुस्तान् पप्रच्छ, 42 प्रीष्टमधि युष्माकं कीदृग्भोधो जायते? स कस्य सन्तानः? ततस्ते प्रत्यवदन्, दायूदः सन्तानः। 43 तदा स उक्तवान्, तर्हि दायूद कथम् आत्माधिष्ठानेन तं प्रभुं वदति? 44 यथा मम प्रभुमिदं वाक्यमवदत् परमेश्वरः। तवारीन् पादपीठं ते यावन्नहि करोम्यहं। तावत् कालं मदीये त्वं दक्षपार्श्वं उपाविश। अतो यदि दायूद तं प्रभुं वदति, तर्हि स कथं तस्य सन्तानो भवति? 45 तदानीं तेषां कोपि तद्वाक्यस्य किमभ्युत्तरं दातुं नाशक्नोतः; 46 तद्दिनमारभ्य तं किमपि वाक्यं प्रष्टुं कस्यापि साहसो नाभवत्।

23 अनन्तरं यीशु ज्ञाननिवहं शिष्यांश्चावदत्, 2 अध्यापकाः द्विज्ञानश्च भूसासने उपविशन्ति, 3 अतस्ते युष्मान् यद्यत् मन्तुम् आज्ञापयन्ति, तत् मन्यध्वं पालयध्वञ्च, किन्तु तेषां कर्मानुत्तरे कर्म न कुरुध्वं; यतस्तेषां वाक्यमात्रं सारं कार्यं किमपि नास्ति। 4 ते दुर्व्वहान् गुरुतरान् भारान् बद्ध्वा मनुष्याणां स्कन्धपरि समर्पयन्ति, किन्तु स्वयमङ्गुल्यैक्यापि न यालयन्ति। 5 केवलं लोकदर्शनाय सर्वकर्माणि कुर्वन्ति; इलतः पट्टबन्धान् प्रसार्य धारयन्ति, स्ववस्त्रेषु च दीर्घग्रन्थीन् धारयन्ति; 6 भोजनभवन उच्यस्थानं, भजनभवने प्रधानमासनं, 7 उद्वे नमस्कारं गुरुरिति सम्बोधनञ्चैतानि सर्वाणि वाञ्छन्ति। 8 किन्तु यूयं गुरव एति सम्बोधनीया मा भवत, यतो युष्माकम् अकः प्रीष्टमेव गुरु 9 यूयं सर्वे मिथो भ्रातरश्च। पुनः पृथिव्यां क्वपि पितेति मा सम्बुध्यध्वं, यतो युष्माकमेकः स्वर्गस्थमेव पिता। 10 यूयं नायकेति सम्भाषिता मा भवत, यतो युष्माकमेकः प्रीष्टमेव नायकः। 11 अपरं युष्माकं मध्ये यः पुमान् श्रेष्ठः स युष्मान् सेविष्यते। 12 यतो यः स्वमुन्नमति, स नतः करिष्यते; किन्तु यः कश्चित् स्वमवतं करोति, स उन्नतः करिष्यते। 13 उन्नतः कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयं मनुजानां समक्षं स्वर्गद्वारं रुन्ध, यूयं स्वयं तेन न प्रविशथ, प्रविविक्षूनपि वारयथ। वत कपटिन उपाध्यायाः द्विज्ञानश्च यूयं छलाद्

दीर्घं प्रार्थ्यं विधवानां सर्व्वस्वं ग्रसथ, युष्माकं घोरतरदण्डो भविष्यति। 14
 ङन्त कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयमेकं स्वधर्मावलम्बिनं कर्तुं सागरं
 भूमण्डलञ्च प्रदक्षिणीकुरुथ, 15 कञ्चन प्राप्य स्वतो द्विगुणनरकभाजनं तं
 कुरुथ। (Geenna g1067) 16 वत अन्धपथदर्शकाः सर्व्वे, यूयं वदथ, मन्दिरस्य
 शपथकरणात् किमपि न दैयं; किन्तु मन्दिरस्थसुवार्णस्य शपथकरणाद्
 दैयं। 17 हे भूढा हे अन्धाः सुवार्णं तत्सुवार्णपावकमन्दिरम् अतयोरुभयो
 र्मध्ये किं श्रेयः? 18 अन्यस्य वदथ, यज्ञवेधाः शपथकरणात् किमपि न
 दैयं, किन्तु तद्गुणस्थितस्य नैवेधस्य शपथकरणाद् दैयं। 19 हे भूढा हे
 अन्धाः, नैवेधं तन्नैवेधपावकवेदितयोरुभयो र्मध्ये किं श्रेयः? 20 अतः
 केनयिद् यज्ञवेधाः शपथे कृते तद्गुणस्थस्य सर्व्वस्य शपथः क्रियते। 21
 केनयित् मन्दिरस्य शपथे कृते मन्दिरतन्निवासिनोः शपथः क्रियते। 22
 केनयित् स्वर्गस्य शपथे कृते ईश्वरीयसिंहासनतद्गुण्युपविष्टयोः शपथः
 क्रियते। 23 ङन्त कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयं पोटिनायाः
 सितय्यत्राया जुरकस्य य दशमांशान् दत्थ, किन्तु व्यवस्थाया गुरुतरान्
 न्यायदयाविश्वासान् परित्यजथ; इमे युष्माभिरायरणीया अभी य न
 लंघनीयाः। 24 हे अन्धपथदर्शका यूयं मशकान् अपसारयथ, किन्तु मडाङ्गान्
 ग्रसथ। 25 ङन्त कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयं पानपात्राणां
 भोजनपात्राणाञ्च बहिः परिष्कुरुथ; किन्तु तदभ्यन्तरं दुरात्मतया कलुषेण
 य परिपूर्णास्ते। 26 हे अन्धाः द्विज्ञानिलोका आदौ पानपात्राणां
 भोजनपात्राणाञ्चभ्यन्तरं परिष्कुरुत, तेन तेषां बहिरपि परिष्कारिष्यते।
 27 ङन्त कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयं शुक्लीकृतश्मशानस्वयं
 भवथ, यथा श्मशानभवनस्य बहिश्चारु, किन्त्वभ्यन्तरं मृतलोकानां
 कीकशैः सर्व्वप्रकारमलेन य परिपूर्णाभुः 28 तथैव यूयमपि लोकानां समक्षं
 बहिर्धार्मिकाः किन्त्वन्तःकरणेषु केवलकापट्याधर्माभ्यां परिपूर्णाः। 29
 डा डा कपटिन उपाध्यायाः द्विज्ञानश्च, यूयं भविष्यद्वादिनां श्मशानगेहं
 निर्माथ, साधूनां श्मशाननिकेतनं शोभयथ 30 वदथ य यद्वि वयं स्वेषां
 पूर्व्वपुरुषाणां काल अस्थास्याम, तर्हि भविष्यद्वादिनां शोणितपातने तेषां
 सङ्भागिनो नाभविष्याम। 31 अतो यूयं भविष्यद्वादिघातकानां सन्ताना
 इति स्वयमेव स्वेषां साक्ष्यं दत्थ। 32 अतो यूयं निजपूर्व्वपुरुषाणां

परिमाणपात्रं परिपूरयत | 33 रे भुजगाः कृष्णभुजगवंशाः, यूयं कथं
 नरकदण्डाद् रक्षिष्यध्वे | (Geenna g1067) 34 पश्यत, युष्माकमन्तिकम्
 अहं भविष्यद्वादिनो बुद्धिमत् उपाध्यायांश्च प्रेषयिष्यामि, किन्तु तेषां
 कतिपया युष्माभिर्घानिष्यन्ते, कुशे य घानिष्यन्ते, केचिद् भजनभवने
 कषाभिराघानिष्यन्ते, नगरे नगरे ताडिष्यन्ते यः 35 तेन सत्पुरुषस्य
 ह्यभिलो रक्तपातमारभ्य बेरिभियः पुत्रं यं सिभरियं यूयं मन्दिरयज्ञवेधो
 र्मध्ये हतवन्तः, तदीयशोणितपातं यावद् अस्मिन् देशे यावतां साधुपुरुषाणां
 शोणितपातो ऽभवत् तत् सर्वेषामागसां दण्डा युष्मासु वर्तिष्यन्ते | 36
 अहं युष्मान्त तथ्यं वदामि, विद्यमानेऽस्मिन् पुरुषे सर्वे वर्तिष्यन्ते | 37 हे
 यिज्ञशलम् हे यिज्ञशलम् नगरि त्वं भविष्यद्वादिनो हतवती, तव समीपं
 प्रेरितांश्च पाषाणैराहतवती, यथा कुक्कुटी शावकान् पक्षाधः संगृह्णाति, तथा
 तव सन्तानान् संग्रहीतुं अहं बह्ववारम् अर्यः; किन्तु त्वं न सममन्यथाः |
 38 पश्यत यष्माकं वासस्थानम् उच्छिन्नं त्यक्ष्यते | 39 अहं युष्मान् तथ्यं
 वदामि, यः परमेश्वरस्य नाम्नागच्छति, स धन्य एति वाणीं यावन्न
 वदिष्यथ, तावत् मां पुनर्न द्रक्ष्यथ |

24 अनन्तरं यीशु र्यदा मन्दिराद् बहिर्गच्छति, तदानीं शिष्यास्तं
 मन्दिरनिर्माणां दर्शयितुमागताः | 2 ततो यीशुस्तानुवाच, यूयं
 किमेतानि न पश्यथ? युष्मानहं सत्यं वदामि, अतन्निययनस्य
 पाषाणैकमध्यन्यपाषाणोपरि न स्थास्यति सर्वाणि भूमिसात् कारिष्यन्ते |
 3 अनन्तरं तस्मिन् जैतुनपर्वतोपरि समुपविष्टे शिष्यास्तस्य समीपमागत्य
 गुप्तं पप्रच्छुः, अता घटनाः कदा भविष्यन्ति? भवत आगमनस्य युगान्तस्य
 य किं लक्ष्म? तदस्मान् वदतु | (aiōn g165) 4 तदानीं यीशुस्तानवोचत्,
 अवधद्वयं, कोपि युष्मान् न भ्रमयेत् | 5 बहवो मम नाम गृह्णन्त
 आगमिष्यन्ति, प्रीष्टोऽहमेवेति वायं वदन्तो बहून् भ्रमयिष्यन्ति | 6
 यूयञ्च संग्रामस्य रास्य याऽम्बरं श्रोष्यथ, अवधद्वयं तेन यञ्चला मा
 भवत, अतान्यवश्यं घटिष्यन्ते, किन्तु तदा युगान्तो नहि | 7 अपरं देशस्य
 विपक्षो देशो राज्यस्य विपक्षो राज्यं भविष्यति, स्थाने स्थाने य दुर्भिक्षं
 महामारी भूकम्पश्च भविष्यन्ति, 8 अेतानि दुःभोपक्रमाः | 9 तदानीं लोका
 दुःखं भोजयितुं युष्मान् परकरेषु समर्पयिष्यन्ति हनिष्यन्ति य, तथा मम

नामकारणाद् यूयं सर्वदृशीयमनुजानां समीपे घृणार्हा भविष्यथ | 10
 बह्वेषु विधनं प्राप्तवत्सु परस्परम् ऋतीयां कृतवत्सु य ओकोऽपरं परकरेषु
 समर्पयिष्यति | 11 तथा बहवो मृषाभविष्यद्वादिन उपस्थाय बहून्
 भ्रमयिष्यन्ति | 12 दुष्कर्माणां बाहुल्यात्त्र बहूनां प्रेम शीतलं भविष्यति |
 13 किन्तु यः कश्चित् शेषं यावद् धैर्यमाश्रयते, सभवे परित्रायिष्यते |
 14 अपरं सर्वदृशीयलोकान् प्रतिमाक्षी भवितुं राजस्य शुभसमाचारः
 सर्वजगति प्रचारिष्यते, अेतादृशि सति युगान्त उपस्थास्यति | 15
 अतो यत् सर्वनाशकृद्गृणार्हा वस्तु दानियेल्भविष्यद्वादिना प्रोक्तं तद् यदा
 पुण्यस्थाने स्थापितं द्रक्ष्यथ, (यः पठति, स बुध्यतां) 16 तदानीं ये
 धिडूदीयदेशे तिष्ठन्ति, ते पर्वतेषु पलायन्तां | 17 यः कश्चिद् गृहपृष्ठे तिष्ठति,
 स गृहात् किमपि वस्त्वानेतुम् अघे नावरोडेत् | 18 यश्च क्षेत्रे तिष्ठति, सोपि
 वस्त्रमानेतुं परावृत्य न यायात् | 19 तदानीं गर्भिणीस्तन्यपाययित्रीणां
 दुर्गति भविष्यति | 20 अतो यष्माकं पलायनं शीतकाले विश्रामवारे वा
 यन्न भवेत्, तदर्थं प्रार्थयध्वम् | 21 आ जगदारम्भाद् अेतत्कालपर्यन्तं
 यादृशः कदापि नाभवत् न य भविष्यति तादृशो मडाकलेशस्तदानीम्
 उपस्थास्यति | 22 तस्य कलेशस्य समयो यदि त्स्वो न क्रियेत, तर्हि
 कस्यापि प्राणिनो रक्षाणं भवितुं न शक्नुयात्, किन्तु मनोनीतमनुजानां
 कृते स कालो त्स्वीकरिष्यते | 23 अपरञ्च पश्यत, श्रीष्टोऽत्र विधते, वा
 तत्र विधते, तदानीं यदी कश्चिद् युष्मान इति वाक्यं वदति, तथापि तत् न
 प्रतीत् | 24 यतो भाक्तप्रीष्टा भाक्तभविष्यद्वादिनश्च उपस्थाय यानि
 मडन्ति लक्ष्माणि चित्रकर्माणि य प्रकाशयिष्यन्ति, ते र्यदि सम्भवेत् तर्हि
 मनोनीतमानवा अपि भ्रामिष्यन्ते | 25 पश्यत, घटनातः पूर्वं युष्मान्
 वार्ताम् अवादिषम् | 26 अतः पश्यत, स प्रान्तरे विधत इति वाक्ये केनचित्
 कथितेपि बहिर्भा गच्छत, वा पश्यत, सोन्तःपुरे विधते, अेतद्वाक्य उक्तेपि
 मा प्रतीत | 27 यतो यथा विधुत् पूर्वदिशो निर्गत्य पश्चिमदिशं यावत्
 प्रकाशते, तथा मानुषपुत्रस्याप्यागमनं भविष्यति | 28 यत्र शवस्तिष्ठति,
 तत्रेव गृध्रा मिलन्ति | 29 अपरं तस्य कलेशसमयस्याव्यवहितपरत्र
 सूर्यस्य तेजो लोभ्यते, यन्द्रमा ज्योस्नां न करिष्यति, नभसो नक्षत्राणि
 पतिष्यन्ति, गगणीया ग्रहाश्च विचलिष्यन्ति | 30 तदानीम् आकाशमध्ये

મનુજસુતસ્ય લક્ષ્મ દર્શિષ્યતે, તતો નિજપરાક્રમેણ મહાતેજસા ચ મેઘારૂઢં
 મનુજસુતં નભસાગચ્છન્તં વિલોક્ય પૃથિવ્યાઃ સર્વવંશીયા વિલપિષ્યન્તિ |
 31 તદાનીં સ મહાશબ્દાયમાનતૂર્ચ્યા વાદકાન્ નિજદૂતાન્ પ્રહેષ્યતિ, તે વ્યોમ્ન
 એકસીમાતોડપરસીમાં યાવત્ ચતુર્દિશસ્તસ્ય મનોનીતજનાન્ આનીય
 મેલયિષ્યન્તિ | 32 ઉડુમ્બરપાદપસ્ય દૃષ્ટાન્તં શિક્ષધ્વં; યદા તસ્ય નવીનાઃ
 શાખા જાયન્તે, પલ્લવાદિશ્ચ નિર્ગચ્છતિ, તદા નિદાઘકાલઃ સવિધો ભવતીતિ
 યૂયં જાનીથ; 33 તદ્દદ્ એતા ઘટના દૃષ્ટ્વા સ સમયો દ્વાર ઉપાસ્થાદ્
 ઇતિ જાનીત | 34 યુષ્માનહં તથ્યં વદામિ, ઇદાનીન્તનજનાનાં ગમનાત્
 પૂર્વમેવ તાનિ સર્વાણિ ઘટિષ્યન્તે | 35 નભોમેદિન્યો લુપ્તયોરપિ મમ
 વાફ્ કદાપિ ન લોપ્સ્યતે | 36 અપરં મમ તાતં વિના માનુષઃ સ્વર્ગસ્થો
 દૂતો વા કોપિ તદ્દિનં તદ્દર્શનં ન જ્ઞાપયતિ | 37 અપરં નોહે વિધમાને
 યાદૃશમભવત્ તાદૃશં મનુજસુતસ્યાગમનકાલેપિ ભવિષ્યતિ | 38 ફલતો
 જલાપ્લાવનાત્ પૂર્વં યદ્દિનં યાવત્ નોહઃ પોતં નારોહત્, તાવત્કાલં યથા
 મનુષ્યા ભોજને પાને વિવહને વિવાહને ચ પ્રવૃત્તા આસન્; 39 અપરમ્
 આપ્લાવિતોયમાગત્ય યાવત્ સકલમનુજાન્ પ્લાવયિત્વા નાનયત્, તાવત્
 તે યથા ન વિદામાસુઃ, તથા મનુજસુતાગમનેપિ ભવિષ્યતિ | 40 તદા
 ક્ષેત્રસ્થિતયોર્દ્વયોરેકો ધારિષ્યતે, અપરસ્ત્યાજિષ્યતે | 41 તથા પેષણ્યા
 પિંષત્યોરુભયો યોષિતોરેકા ધારિષ્યતેડપરા ત્યાજિષ્યતે | 42 યુષ્માકં
 પ્રભુઃ કસ્મિન્ દર્શ આગમિષ્યતિ, તદ્ યુષ્માભિ નાવગમ્યતે, તસ્માત્
 જાગ્રતઃ સન્તસ્તિષ્ઠત | 43 કુત્ર યામે સ્તેન આગમિષ્યતીતિ ચેદ્ ગૃહસ્થો
 જ્ઞાતુમ્ અશક્ષ્યત્, તર્હિ જાગરિત્વા તં સન્ધિં કર્ત્વિતુમ્ અવારયિષ્યત્ તદ્
 જાનીત | 44 યુષ્માભિરવધીયતાં, યતો યુષ્માભિ ર્યત્ર ન બુદ્ધ્યતે, તત્રૈવ
 દર્શે મનુજસુત આચાસ્યતિ | 45 પ્રભુ નિજપરિવારાન્ યથાકાલં ભોજયિતું
 યં દાસમ્ અધ્યક્ષીકૃત્ય સ્થાપયતિ, તાદૃશો વિશ્વાસ્યો ધીમાન્ દાસઃ કઃ?
 46 પ્રભુરાગત્ય યં દાસં તથાયરન્તં વીક્ષતે, સએવ ધન્યઃ | 47 યુષ્માનહં
 સત્યં વદામિ, સ તં નિજસર્વસ્વસ્યાધિપં કરિષ્યતિ | 48 કિન્તુ પ્રભુરાગન્તું
 વિલમ્બત ઇતિ મનસિ ચિન્તયિત્વા યો દુષ્ટો દાસો 49 ડપરદાસાન્ પ્રહર્તું
 મત્તાનાં સર્જે ભોક્તું પાતુઞ્ચ પ્રવર્તતે, 50 સ દાસો યદા નાપેક્ષતે, યઞ્ચ દર્શં ન

જાનાતિ, તત્કાલએવ તત્પ્રભુરુપસ્થાસ્યતિ | 51 તદા તં દર્શયિત્વા યત્ર
સ્થાને રોદનં દન્તઘર્ષણાઆસાતે, તત્ર કપટિભિઃ સાકં તદ્દશાં નિરૂપયિષ્યતિ |

25 યા દશ કન્યાઃ પ્રદીપાન્ ગૃહ્ણત્યો વરં સાક્ષાત્ કર્તું બહિરિતાઃ, તાભિસ્તદા
સ્વર્ગીયરાજ્યસ્ય સાદૃશ્યં ભવિષ્યતિ | 2 તાસાં કન્યાનાં મધ્યે પત્ર સુધિયઃ
પત્ર દુર્ધિય આસન્ | 3 યા દુર્ધિયસ્તાઃ પ્રદીપાન્ સજ્ઞે ગૃહીત્વા તૈલં ન
જગૃહુઃ, 4 કિન્તુ સુધિયઃ પ્રદીપાન્ પાત્રેણ તૈલત્ર જગૃહુઃ | 5 અનન્તરં વરે
વિલમ્બિતે તાઃ સર્વા નિદ્રાવિષ્ટા નિદ્રાં જગ્મુઃ | 6 અનન્તરમ્ અર્દ્ધરાત્રે
પશ્યત વર આગચ્છતિ, તં સાક્ષાત્ કર્તું બહિર્યાતેતિ જનરવાત્ 7 તાઃ
સર્વાઃ કન્યા ઉત્થાય પ્રદીપાન્ આસાદયિતું આરભન્ત | 8 તતો દુર્ધિયઃ
સુધિય ઊચુઃ, કિન્ત્રિત્ તૈલં દત્ત, પ્રદીપા અસ્માકં નિર્વ્યાણાઃ | 9 કિન્તુ
સુધિયઃ પ્રત્યવદન્, દત્તે યુષ્માનસ્માંશ્ચ પ્રતિ તૈલં ન્યૂનીભવેત્, તસ્માદ્
વિક્રેતૃણાં સમીપં ગત્વા સ્વાર્થં તૈલં ક્રીણીત | 10 તદા તાસુ કેતું ગતાસુ
વર આજગામ, તતો યાઃ સજ્જિતા આસન્, તાસ્તેન સાકં વિવાહીયં વેશ્મ
પ્રવિવિશુઃ | 11 અનન્તરં દ્વારે રુદ્ધે અપરાઃ કન્યા આગત્ય જગદુઃ, હે
પ્રભો, હે પ્રભો, અસ્માન્ પ્રતિ દ્વારં મોચય | 12 કિન્તુ સ ઉક્તવાન્, તથ્યં
વદામિ, યુષ્માનહં ન વેદિમિ | 13 અતો જાગ્રતઃ સન્તસ્તિષ્ઠત, મનુજસુતઃ
કસ્મિન્ દિને કસ્મિન્ દર્શડે વાગમિષ્યતિ, તદ્ યુષ્માભિ ન જ્ઞાયતે | 14
અપરં સ એતાદૃશઃ કસ્યચિત્ પુંસસ્તુલ્યઃ, યો દૂરદેશં પ્રતિ યાત્રાકાલે
નિજદાસાન્ આહૂય તેષાં સ્વસ્વસામર્થ્યાનુરૂપમ્ 15 એકસ્મિન્ મુદ્રાણાં પત્ર
પોટલિકાઃ અન્યસ્મિંશ્ચ દ્વે પોટલિકે અપરસ્મિંશ્ચ પોટલિકૈકામ્ ઇત્યં પ્રતિજનં
સમર્પ્ય સ્વયં પ્રવાસં ગતવાન્ | 16 અનન્તરં યો દાસઃ પત્ર પોટલિકાઃ
લબ્ધવાન્, સ ગત્વા વાણિજ્યં વિધાય તા દ્વિગુણીયકાર | 17 યશ્ચ દાસો દ્વે
પોટલિકે અલભત, સોપિ તા મુદ્રા દ્વિગુણીયકાર | 18 કિન્તુ યો દાસ એકાં
પોટલિકાં લબ્ધવાન્, સ ગત્વા ભૂમિં ખનિત્વા તન્મધ્યે નિજપ્રભોસ્તા મુદ્રા
ગોપયાત્રકાર | 19 તદનન્તરં બહુતિથે કાલે ગતે તેષાં દાસાનાં પ્રભુરાગત્ય
તૈર્દાસૈઃ સમં ગણયાત્રકાર | 20 તદાનીં યઃ પત્ર પોટલિકાઃ પ્રાપ્તવાન્ સ તા
દ્વિગુણીકૃતમુદ્રા આનીય જગાદ; હે પ્રભો, ભવતા મયિ પત્ર પોટલિકાઃ
સમર્પિતાઃ, પશ્યતુ, તા મયા દ્વિગુણીકૃતાઃ | 21 તદાનીં તસ્ય પ્રભુસ્તમુવાચ,
હે ઉત્તમ વિશ્વાસ્ય દાસ, ત્વં ધન્યોસિ, સ્તોકેન વિશ્વાસ્યો જાતઃ, તસ્માત્

ત્વાં બહુવિતાધિપં કરોમિ, ત્વં સ્વપ્રભોઃ સુખસ્ય ભાગી ભવ | 22 તતો યેન
 દ્વે પોટલિકે લબ્ધે સોપ્યાગત્ય જગાદ, હે પ્રભો, ભવતા મયિ દ્વે પોટલિકે
 સમર્પિતે, પશ્યતુ તે મયા દ્વિગુણીકૃતે | 23 તેન તસ્ય પ્રભુસ્તમવોચત્, હે
 ઉત્તમ વિશ્વાસ્ય દાસ, ત્વં ધન્યોસિ, સ્તોકેન વિશ્વાસ્યો જાતઃ, તસ્માત્
 ત્વાં બહુદ્રવિણાધિપં કરોમિ, ત્વં નિજપ્રભોઃ સુખસ્ય ભાગી ભવ | 24
 અનન્તરં ચ એકાં પોટલિકાં લબ્ધવાન્, સ એત્ય કથિતવાન્, હે પ્રભો,
 ત્વાં કઠિનનરં જ્ઞાતવાન્, ત્વયા યત્ર નોપ્તં, તત્રૈવ કૃત્યતે, યત્ર ચ ન કીર્ણં,
 તત્રૈવ સંગૃહ્યતે | 25 અતોહં સશક્તુઃ સન્ ગત્વા તવ મુદ્રા ભૂમધ્યે સંગોપ્ય
 સ્થાપિતવાન્, પશ્ય, તવ યત્ તદેવ ગૃહાણ | 26 તદા તસ્ય પ્રભુઃ પ્રત્યવદત્
 રે દુષ્ટાલસ દાસ, યત્રાહં ન વપામિ, તત્ર છિન્નમ્, યત્ર ચ ન કિરામિ, તત્રેવ
 સંગૃહ્ણામીતિ ચેદજાનાસ્તર્હિ 27 વણિક્ષુ મમ વિત્તાર્પણં તવોચિતમાસીત્,
 યેનાહમાગત્ય વૃદ્ધ્યા સાકં મૂલમુદ્રાઃ પ્રાપ્સ્યમ્ | 28 અતોસ્માત્ તાં
 પોટલિકામ્ આદાય યસ્ય દશ પોટલિકાઃ સન્તિ તસ્મિન્નર્પયત | 29 યેન
 વર્દ્યતે તસ્મિન્નૈવાર્પિષ્યતે, તસ્યૈવ ચ બાહુલ્યં ભવિષ્યતિ, કિન્તુ યેન ન
 વર્દ્યતે, તસ્યાન્તિકે યત્ કિઞ્ચન તિષ્ઠતિ, તદપિ પુનર્મોચ્યતે | 30 અપરં યૂયં
 તમકર્મ્મણ્યં દાસં નીત્વા યત્ર સ્થાને કન્દનં દન્તઘર્ષણઞ્ચ વિધેતે, તસ્મિન્
 બહિર્ભૂતતમસિ નિક્ષિપત | 31 યદા મનુજસુતઃ પવિત્રદૂતાન્ સક્ષિન્ઃ કૃત્વા
 નિજપ્રભાવેનાગત્ય નિજતેજોમયે સિંહાસને નિવેક્ષ્યતિ, 32 તદા તત્સમ્મુખે
 સર્વજાતીયા જના સંમેલિષ્યન્તિ | તતો મેષપાલકો યથા છાગેભ્યોડવીન્
 પૃથક્ કરોતિ તથા સોપ્યેકસ્માદન્યમ્ ઇત્યં તાન્ પૃથક કૃત્વાવીન્ 33
 દક્ષિણે છાગાંશ્ર વામે સ્થાપયિષ્યતિ | 34 તતઃ પરં રાજા દક્ષિણસ્થિતાન્
 માનવાન્ વદિષ્યતિ, આગચ્છત મત્તાતસ્યાનુગ્રહભાજનાનિ, યુષ્મત્કૃત આ
 જગદારમ્ભત્ યદ્ રાજ્યમ્ આસાદિતં તદધિકુરુત | 35 યતો બુભુક્ષિતાય
 મહાં ભોજ્યમ્ અદત્, પિપાસિતાય પેયમદત્, વિદેશિનં માં સ્વસ્થાનમનયત,
 36 વસ્ત્રહીનં માં વસનં પર્યઘાપયત, પીડીતં માં દ્રષ્ટુમાગચ્છત, કારાસ્થઞ્ચ
 માં વીક્ષિતુમ આગચ્છત | 37 તદા ધાર્મિકાઃ પ્રતિવદિષ્યન્તિ, હે પ્રભો,
 કદા ત્વાં ક્ષુધિતં વીક્ષ્ય વયમભોજયામ? વા પિપાસિતં વીક્ષ્ય અપાયયામ?
 38 કદા વા ત્વાં વિદેશિનં વિલોક્ય સ્વસ્થાનમનયામ? કદા વા ત્વાં નગ્નં
 વીક્ષ્ય વસનં પર્યઘાપયામ? 39 કદા વા ત્વાં પીડિતં કારાસ્થઞ્ચ વીક્ષ્ય

त्वदन्तिकमगच्छाम? 40 तदानीं राजा तान् प्रतिवद्विष्यति, युष्मानहं सत्यं
वदामि, ममैतेषां भ्रातृणां मध्ये कञ्चनैकं क्षुद्रतमं प्रति यद् अकुरुत, तन्मां
प्रत्यकुर्वत | 41 पश्चात् स वामस्थितान् जनान् वद्विष्यति, रे शापग्रस्ताः
सर्वे, शैताने तस्य दूतेभ्यश्च योऽनन्तवह्निरासादित आस्ते, यूयं मदनिकात्
तमग्निं गच्छत | (aiōnios g166) 42 यतो क्षुधिताय मह्यमाहारं नादत्त,
पिपासिताय मह्यं पेयं नादत्त, 43 विदेशिनं मां स्वस्थानं नानयत, वसनदीनं
मां वसनं न पर्यधापयत, पीडितं कारास्थानं मां वीक्षितुं नागच्छत | 44
तदा ते प्रतिवद्विष्यन्ति, हे प्रभो, कदा त्वां क्षुधितं वा पिपासितं वा विदेशिनं
वा नग्नं वा पीडितं वा कारास्थं वीक्ष्य त्वां नासेवामहि? 45 तदा स तान्
वद्विष्यति, तथ्यमहं युष्मान् ब्रवीमि, युष्माभिरेषां कञ्चन क्षोदिष्ठं प्रति
यन्नाकारि, तन्मां प्रत्येव नाकारि | 46 पश्चाद्यनन्तशास्तिं किन्तु धार्मिका
अनन्तायुषं भोक्तुं यास्यन्ति | (aiōnios g166)

26 यीशुरेतान् प्रस्तावान् समाप्य शिष्यानूये, 2 युष्माभिर्ज्ञातं
दिनद्वयात् परं निस्तारमहं उपस्थास्यति, तत्र मनुजसुतः कुशेन हन्तुं
परकरेषु समर्पिष्यते | 3 ततः परं प्रधानयाजकाध्यापकप्राञ्चः क्रियद्गानाभ्यो
महायाजकस्यावृत्तिकायां मिलित्वा 4 केनोपायेन यीशुं धृत्वा हन्तुं
शक्युयुरिति मन्त्रयाञ्चक्रुः | 5 किन्तु तैरुक्तं महकाले न धर्तव्यः, धृते
प्रजानां कलहेन भवितुं शक्यते | 6 ततो बैथनियापुरे शिमोनाभ्यस्य
कुष्ठिनो वेश्मनि यीशौ तिष्ठति 7 कायन योषा श्वेतोपलभाजनेन
महार्घ्यं सुगन्धि तैलमानीय भोजनायोपविशतस्तस्य शिरोभ्यषेयत् |
8 किन्तु तदालोक्य तच्छिष्यैः कुपितैरुक्तं, कुत एतथमपव्ययते? 9 येद्विदं
व्यक्रेष्यत, तर्हि भूरिमूल्यं प्राप्य दरिद्रेभ्यो व्यतारिष्यत | 10 यीशुना
तदवगत्य ते समुदिताः, योषामेनां कुतो दुःखिनीं कुरुथ, सा मां प्रति
साधु कर्माकार्षीत् | 11 युष्माकमं समीपे दरिद्राः सततमेवासते, किन्तु
युष्माकमन्तिकेहं नासे सततं | 12 सा मम कायोपरि सुगन्धितैलं सिक्त्वा मम
श्मशानदानकर्माकार्षीत् | 13 अतोहं युष्मान् तथ्यं वदामि सर्वस्मिन् जगति
यत्र यत्रैष सुसमाचारः प्रयारिष्यते, तत्र तत्रैतस्या नार्याः स्मरणार्थम्
कर्मेहं प्रयारिष्यते | 14 ततो द्वादशशिष्याणाम् षष्कुरियोतीययिडूदानामक
अेकः शिष्यः प्रधानयाजकानामन्तिकं गत्वा कथितवान्, 15 यद्वि युष्माकं

કરેષુ યીશું સમર્પયામિ, તર્હિ કિં દાસ્યથ? તદાનીં તે તસ્મૈ ત્રિંશન્મુદ્રા દાતું
 સ્થિરીકૃતવન્તઃ | 16 સ તદારભ્ય તં પરકરેષુ સમર્પયિતું સુયોગં ચેષ્ટિતવાન્ |
 17 અનન્તરં કિણ્વશૂન્યપૂપર્વ્વાણઃ પ્રથમેહિ શિષ્યા યીશુમ્ ઉપગત્ય
 પપ્રચ્છુઃ ભવત્કૃતે કુત્ર વયં નિસ્તારમહભોજ્યમ્ આયોજયિષ્યામઃ? ભવતઃ
 કેચ્છા? 18 તદા સ ગદિતવાન્, મધ્યેનગરમમુકપુંસઃ સમીપં વ્રજિત્વા વદત,
 ગુરુ ગદિતવાન્, મત્કાલઃ સવિધઃ, સહ શિષ્યૈસ્ત્વદાલયે નિસ્તારમહભોજ્યં
 ભોક્ષ્યે | 19 તદા શિષ્યા યીશોસ્તાદૃશનિદેશાનુરૂપકર્મ વિધાય તત્ર
 નિસ્તારમહભોજ્યમાસાદયામાસુઃ | 20 તતઃ સન્ધ્યાયાં સત્યાં દ્વાદશભિઃ
 શિષ્યૈઃ સાકં સ ન્યવિશત્ | 21 અપરં ભુઞ્જાન ઉક્તવાન્ યુષ્માન્ તથ્યં
 વદામિ, યુષ્માકમેકો માં પરકરેષુ સમર્પયિષ્યતિ | 22 તદા તેડતીવ દુઃખિતા
 એકેકશો વક્તુમારેભિરે, હે પ્રભો, સ કિમહં? 23 તતઃ સ જગાદ, મયા સાકં
 યો જનો ભોજનપાત્રે કરં સંક્ષિપતિ, સ એવ માં પરકરેષુ સમર્પયિષ્યતિ | 24
 મનુજસુતમધિ યાદૃશં લિખિતમાસ્તે, તદનુરૂપા તદ્ગતિ ભવિષ્યતિ; કિન્તુ
 યેન પુંસા સ પરકરેષુ સમર્પયિષ્યતે, હા હા ચેત્ સ નાજનિષ્યત, તદા તસ્ય
 ક્ષેમમભવિષ્યત્ | 25 તદા ચિહ્નનામા યો જનસ્તં પરકરેષુ સમર્પયિષ્યતિ,
 સ ઉક્તવાન્, હે ગુરો, સ કિમહં? તતઃ સ પ્રત્યુક્તવાન્, ત્વયા સત્યં ગદિતમ્ |
 26 અનન્તરં તેષામશનકાલે યીશુઃ પૂપમાદાયેશ્વરીયગુણાનનૂધ ભંક્ત્વા
 શિષ્યેભ્યઃ પ્રદાય જગાદ, મદ્વપુઃસ્વરૂપમિમં ગૃહીત્વા ખાદત | 27 પશ્ચાત્ સ
 કંસં ગૃહ્ણન્ ઈશ્વરીયગુણાનનૂધ તેભ્યઃ પ્રદાય કથિતવાન્, સર્વે યુષ્માભિરનેન
 પાતવ્યં, 28 યસ્માદનેકેષાં પાપમર્ષણાય પાતિતં યન્મન્ત્નનિયમરૂપશોણિતં
 તદેતત્ | 29 અપરમહં નૂત્નગોસ્તનીરસં ન પાસ્યામિ, તાવત્ ગોસ્તનીફલરસં
 પુનઃ કદાપિ ન પાસ્યામિ | 30 પશ્ચાત્ તે ગીતમેકં સંગીય જૈતુનાખ્યગિરિં
 ગતવન્તઃ | 31 તદાનીં યીશુસ્તાનવોચત્, અસ્યાં રજન્યામહં યુષ્માકં
 સર્વેષાં વિઘ્નરૂપો ભવિષ્યામિ, યતો લિખિતમાસ્તે, "મેષાણાં રક્ષકો યસ્તં
 પ્રહરિષ્યામ્યહં તતઃ | મેષાણાં નિવહો નૂનં પ્રવિકીર્ણો ભવિષ્યતિ" | | 32
 કિન્તુ શ્મશાનાત્ સમુત્થાય યુષ્માકમગ્રેડહં ગાલીલં ગમિષ્યામિ | 33 પિતરસ્તં
 પ્રોવાય, ભવાંશ્રેત્ સર્વેષાં વિઘ્નરૂપો ભવતિ, તથાપિ મમ ન ભવિષ્યતિ |
 34 તતો યીશુના સ ઉક્તઃ, તુભ્યમહં તથ્યં કથયામિ, યામિન્યામસ્યાં
 ચરણાયુધસ્ય રવાત્ પૂર્વ્વ ત્વં માં ત્રિ નાંકીકરિષ્યસિ | 35 તતઃ પિતર

ઉદિતવાનુ, યદધિ ત્વયા સમં મર્તવ્યં, તથાપિ કદાપિ ત્વાં ન નાઙ્ગીકરિષ્યામિ;
 તથૈવ સર્વે શિષ્યાશ્રોયુઃ | 36 અનન્તરં યીશુઃ શિષ્યૈઃ સાકં ગેત્શિમાનીનામકં
 સ્થાનં પ્રસ્થાય તેભ્યઃ કથિતવાનુ, અદઃ સ્થાનં ગત્વા યાવદહં પ્રાર્થયિષ્યે
 તાવદ્ યૂયમત્રોપવિશત | 37 પશ્ચાત્ સ પિતરં સિવદિયસુતૌ ચ સઙ્ગિનઃ કૃત્વા
 ગતવાનુ, શોકાકુલોડતીવ વ્યથિતશ્ચ બભૂવ | 38 તાનવાદીચ્ય મૃતિયાતનેવ
 મત્રાણાનાં યાતના જાયતે, યૂયમત્ર મયા સાદ્ધ્ જાગૃત | 39 તતઃ સ કિઞ્ચિદ્દૂરં
 ગત્વાઘોમુખઃ પતન્ પ્રાર્થયાઞ્ચક્રે, હે મત્પિતર્યદિ ભવિતું શકનોતિ, તર્હિ
 કંસોડયં મત્તો દૂરં યાતુઃ કિન્તુ મદિચ્છાવત્ ન ભવતુ, ત્વદિચ્છાવદ્ ભવતુ |
 40 તતઃ સ શિષ્યાનુપેત્ય તાન્ નિદ્રતો નિરીક્ષ્ય પિતરાય કથયામાસ, યૂયં
 મયા સાકં દણ્ડમેકમપિ જાગરિતું નાશન્કુત? 41 પરીક્ષાયાં ન પતિતું જાગૃત
 પ્રાર્થયધ્વઞ્ચ; આત્મા સમુદ્ધતોસ્તિ, કિન્તુ વપુ દુર્બલં | 42 સ દ્વિતીયવારં
 પ્રાર્થયાઞ્ચક્રે, હે મત્તાત, ન પીતે યદિ કંસમિદં મત્તો દૂરં યાતું ન શકનોતિ, તર્હિ
 ત્વદિચ્છાવદ્ ભવતુ | 43 સ પુનરેત્ય તાન્ નિદ્રતો દદર્શ, યતસ્તેષાં નેત્રાણિ
 નિદ્રયા પૂર્ણાન્યાસન્ | 44 પશ્ચાત્ સ તાન્ વિહાય વ્રજિત્વા તૃતીયવારં
 પૂર્વવત્ કથયન્ પ્રાર્થિતવાનુ | 45 તતઃ શિષ્યાનુપાગત્ય ગદિતવાનુ, સામ્પ્રતં
 શયાનાઃ કિં વિશ્રામ્યથ? પશ્યત, સમય ઉપાસ્થાત, મનુજસુતઃ પાપિનાં
 કરેષુ સમર્પ્યતે | 46 ઉત્તિષ્ઠત, વયં યામઃ, યો માં પરકરેષુ મસર્પયિષ્યતિ,
 પશ્યત, સ સમીપમાયાતિ | 47 એતત્કથાકથનકાલે દ્વાદશશિષ્યાણામેકો
 યિહૂદાનામકો મુખ્યયાજકલોકપ્રાચીનૈઃ પ્રહિતાન્ અસિધારિયષ્ટિધારિણો
 મનુજાન્ ગૃહીત્વા તત્સમીપમુપતસ્થૌ | 48 અસૌ પરકરેષ્વર્પયિતા પૂર્વં
 તાન્ ઇત્યં સદ્ગેતયામાસ, યમહં યુષ્મિષ્યે, સોડસૌ મનુજઃ, સએવ યુષ્માભિ
 ધાર્યતાં | 49 તદા સ સપદિ યીશુમુપાગત્ય હે ગુરો, પ્રણામામીત્યુક્ત્વા
 તં યુયુમ્બે | 50 તદા યીશુસ્તમુવાચ, હે મિત્રં કિમર્થમાગતોસિ? તદા
 તૈરાગત્ય યીશુરાક્રમ્ય દઘે | 51 તતો યીશોઃ સઙ્ગિનામેકઃ કરં પ્રસાર્ય
 કોષાદસિં બહિષ્કૃત્ય મહાયાજકસ્ય દાસમેકમાહત્ય તસ્ય કર્ણં ચિચ્છેદ |
 52 તતો યીશુસ્તં જગાદ, ખડ્ગં સ્વસ્થાને નિઘેહિ યતો યે યે જના અસિં
 ધારયન્તિ, તએવાસિના વિનશ્યન્તિ | 53 અપરં પિતા યથા મદન્તિકં
 સ્વર્ગીયદૂતાનાં દ્વાદશવાહિનીતોડધિકં પ્રહિણુયાત્ મયા તમુદ્દિશ્યેદાનીમેવ
 તથા પ્રાર્થયિતું ન શક્યતે, ત્વયા કિમિત્યં જ્ઞાયતે? 54 તથા સતીત્યં

ઘટિષ્યતે ધર્મપુસ્તકસ્ય ચદિદં વાક્યં તત્ કથં સિધ્યેત્? 55 તદાનીં યીશુ
 ઈનનિવહં જગાદ, યૂયં ખડ્ગયષ્ટીન્ આદાય માં કિં ચૌરં ધર્તુમાયાતાઃ? અહં
 પ્રત્યહં યુષ્માભિઃ સાકમુપવિશ્ય સમુપાદિશં, તદા માં નાધરત; 56 કિન્તુ
 ભવિષ્યદ્વાદિનાં વાક્યાનાં સંસિદ્ધયે સર્વમેતદભૂત્ | તદા સર્વે શિષ્યાસ્તં
 વિહાય પલાયન્ત | 57 અનન્તરં તે મનુજા યીશુ ધૃત્વા યત્રાધ્યાપકપ્રાઞ્ઃ
 પરિષદં કુર્વન્ત ઉપાવિશન્ તત્ર કિયક્ષાનામકમહાયાજકસ્યાન્તિકં નિન્યુઃ |
 58 કિન્તુ શેષે કિં ભવિષ્યતીતિ વેતું પિતરો દૂરે તત્પશ્યાદ્ વ્રજિત્વા
 મહાયાજકસ્યાઢ્ઠાલિકાં પ્રવિશ્ય દાસૈઃ સહિત ઉપાવિશત્ | 59 તદાનીં
 પ્રધાનયાજકપ્રાચીનમન્ત્રિણઃ સર્વે યીશુ હન્તું મૃષાસાક્ષ્યમ્ અલિપ્સન્ત, 60
 કિન્તુ ન લેભિરે | અનેકેષુ મૃષાસાક્ષિષ્વાગતેષ્વપિ તન્ન પ્રાપુઃ | 61 શેષે
 દ્વૌ મૃષાસાક્ષિણાવાગત્ય જગદતુઃ, પુમાનયમકથયત, અહમીશ્વરમન્દિરં
 ભંકત્વા દિનત્રયમધ્યે તન્નિર્માતું શકનોમિ | 62 તદા મહાયાજક ઉત્થાય
 યીશુમ્ અવાદીત્ | ત્વં કિમપિ ન પ્રતિવદસિ? ત્વામધિ કિમેતે સાક્ષ્યં
 વદન્તિ? 63 કિન્તુ યીશુ મૌનીભૂય તસ્યૌ | તતો મહાયાજક ઉક્તવાન્,
 ત્વામ્ અમરેશ્વરનામ્ના શપયામિ, ત્વમીશ્વરસ્ય પુત્રોઽભિષિક્તો ભવસિ
 નવેતિ વદ | 64 યીશુઃ પ્રત્યવદત, ત્વં સત્યમુક્તવાન્; અહં યુષ્માન્ તથ્યં
 વદામિ, ઇતઃપરં મનુજસુતં સર્વશક્તિમતો દક્ષિણપાર્શ્વે સ્થાતું ગગણસ્થં
 જલધરાનારુઢ્યાયાન્તં વીક્ષધ્વે | 65 તદા મહાયાજકો નિજવસનં છિત્વા
 જગાદ, એષ ઈશ્વરં નિન્દિતવાન્, અસ્માકમપરસાક્ષ્યેણ કિં પ્રયોજનં?
 પશ્યત, યૂયમેવાસ્યાસ્યાદ્ ઈશ્વરનિન્દાં શ્રુતવન્તઃ, 66 યુષ્માભિઃ કિં
 વિવિચ્યતે? તે પ્રત્યૂચુઃ, વધાર્હોઽયં | 67 તતો લોકેસ્તદાસ્યે નિષ્ઠીવિતં
 કેચિત્ પ્રતલમાહત્ય કેચિચ્ચ ચપેટમાહત્ય ભભાષિરે, 68 હે ખ્રીષ્ટ ત્વાં
 કશ્ચપેટમાહતવાન્? ઇતિ ગણયિત્વા વદાસ્માન્ | 69 પિતરો બહિરઙ્ગન
 ઉપવિશતિ, તદાનીમેકા દાસી તમુપાગત્ય ભભાષે, ત્વં ગાલીલીયયીશોઃ
 સહચરએકઃ | 70 કિન્તુ સ સર્વેષાં સમક્ષમ્ અનઙ્ગીકૃત્વાવાદીત, ત્વયા
 ચદુચ્યતે, તદર્થમહં ન વેદ્મિ | 71 તદા તસ્મિન્ બહિર્દ્વારં ગતે ડન્યા દાસી તં
 નિરીક્ષ્ય તત્રત્યજનાનવદત, અયમપિ નાસરતીયયીશુના સાર્દ્ધમ્ આસીત્ |
 72 તતઃ સ શપથેન પુનરનઙ્ગીકૃત્ય કથિતવાન્, તં નરં ન પરિચિનોમિ | 73
 ક્ષણાત્ પરં તિષ્ઠન્તો જના એત્ય પિતરમ્ અવદન્, ત્વમવશ્યં તેષામેક ઇતિ

त्वद्गुण्यारણ्यमेव धોतयति। 74 किन्तु सोऽभिशाप्य कथितवान्, तं जन्
नाहं परिचिनोमि, तदा सपदि कुक्कुटो रुराव। 75 कुक्कुटस्त्वात् प्राङ् त्वं मां
त्रिरपाह्नोष्यसे, यैषा वाग् यीशुनावादि तां पितरः संस्मृत्य बहिरित्वा
भेदाद् भृशं यच्छन्द।

27 प्रभाते जाते प्रधानयाजकलोकप्राचीना यीशुं हन्तुं तत्प्रतिकूलं मन्त्रयित्वा
2 तं बह्व्या नीत्वा पन्तीयपीलाताप्याधिपे समर्पयामासुः। 3 ततो
यीशोः परकरेव्वर्पयिता यिडूदास्तत्राण्णदण्डाणां विदित्वा सन्तप्तमनाः
प्रधानयाजकलोकप्राचीनानां समक्षं तास्त्रींशन्मुद्राः प्रतिदायावादीत्, 4
अेतन्निरागोनप्राणपरकरार्पणात् कलुषं कृतवानहं। तदा त उदितवन्तः,
तेनास्माकं किं? त्वया तद् बुध्यताम्। 5 ततो यिडूदा मन्दिरमध्ये ता
मुद्रा निक्षिप्य प्रस्थितवान् एत्वा य स्वयमात्मानमुद्धबन्ध। 6 पश्चात्
प्रधानयाजकास्ता मुद्रा आदाय कथितवन्तः, अेता मुद्राः शोणितमूल्यं
तस्माद् भाण्डागारे न निधातव्याः। 7 अनन्तरं ते मन्त्रयित्वा विदेशिनां
श्मशानस्थानाय ताभिः कुलालस्य क्षेत्रमक्रीणन्। 8 अतोऽधापि तत्स्थानं
रक्तक्षेत्रं वदन्ति। 9 एत्थं सति एसायेलीयसन्तानै र्यस्य मूल्यं निरुपितं,
तस्य त्रिंशन्मुद्रामानं मूल्यं 10 मां प्रति परमेश्वरस्यादेषात् तेभ्य आदीयत,
तेन य कुलालस्य क्षेत्रं क्रीतमिति यद्वयनं यिरिमियभविष्यद्वादिना प्रोक्तं
तत् तदासिध्यत्। 11 अनन्तरं यीशौ तदधिपतेः सम्भुष उपतिष्ठति
स तं पप्रच्छ, त्वं किं यिडूदीयानां राजा? तदा यीशुस्तमवदत्, त्वं
सत्यमुक्तवान्। 12 किन्तु प्रधानयाजकप्राचीनैरभियुक्तेन तेन किमपि न
प्रत्यवादि। 13 ततः पीलातेन स उदितः, एभे त्वत्प्रतिकूलतः कति कति
साक्ष्यं ददति, तत् त्वं न शृणोषि? 14 तथापि स तेषामेकस्यापि वयस
उत्तरं नोदितवान्; तेन सोऽधिपति र्महायित्रं विदामास। 15 अन्यथ्य
तन्मडकालेऽधिपतेरेतादृशी रातिरासीत्, प्रजा यं कञ्चन बन्धिनं यायन्ते,
तमेव स मोचयतीति। 16 तदानीं बरब्बानामा कश्चित् प्यातबन्ध्यासीत्।
17 ततः पीलातस्तत्र मिलितान् लोकान् अपृच्छत्, अेष बरब्बा बन्धी
प्रीष्टविष्यातो यीशुश्चैतयोः कं मोचयिष्यामि? युष्माकं किमीप्सितं? 18
तैरीर्थ्या स समर्पित एति स ज्ञातवान्। 19 अपरं विचारासनोपवेशनकाले
पीलातस्य पत्नी भृत्यं प्रहित्य तस्मै कथयामास, तं धार्मिकमनुजं प्रति त्वया

કિમપિ ન કર્તવ્યં; યસ્માત્ તત્કૃતેઽધાહં સ્વપ્ને પ્રભૂતકષ્ટમલભે | 20 અનન્તરં
 પ્રધાનયાજકપ્રાચીના બરબ્બાં યાયિત્વાદાતું યીશુઞ્ચ હન્તું સકલલોકાન્
 પ્રાવર્તયન્ | 21 તતોઽધિપતિસ્તાન્ પૃષ્ટવાન્, એતયોઃ કમહં મોચયિષ્યામિ?
 યુષ્માકં કેચ્છા? તે પ્રોયુર્બરબ્બાં | 22 તદા પીલાતઃ પપ્રચ્છ, તર્હિં યં ખ્રીષ્ટં
 વદન્તિ, તં યીશું કિં કરિષ્યામિ? સર્વે કથયામાસુઃ, સ ક્રુશેન વિધ્યતાં | 23
 તતોઽધિપતિસ્વાદીત્, કુતઃ? કિં તેનાપરાદ્ધં? કિન્તુ તે પુનરુચૈર્જગદ્ઃ, સ
 ક્રુશેન વિધ્યતાં | 24 તદા નિજવાક્યમગ્રાહ્યમભૂત્, કલહશ્રાપ્યભૂત્, પીલાત
 ઇતિ વિલોક્ય લોકાનાં સમક્ષં તોયમાદાય કરૌ પ્રક્ષાલ્યાવોચત્, એતસ્ય
 ધાર્મિકમનુષ્યસ્ય શોણિતપાતે નિર્દોષોઽહં, યુષ્માભિરેવ તદ્ બુધ્યતાં |
 25 તદા સર્વાઃ પ્રજાઃ પ્રત્યવોચન્, તસ્ય શોણિતપાતાપરાધોઽસ્માકમ્
 અસ્મત્સન્તાનાનાઞ્ચોપરિ ભવતુ | 26 તતઃ સ તેષાં સમીપે બરબ્બાં
 મોચયામાસ યીશુન્તુ કષાભિરાહત્ય ક્રુશેન વેધિતું સમર્પયામાસ | 27
 અનન્તરમ્ અધિપતેઃ સેના અધિપતેર્ગૃહં યીશુમાનીય તસ્ય સમીપે સેનાસમૂહં
 સંજગદ્ઃ | 28 તતસ્તે તસ્ય વસનં મોચયિત્વા કૃષ્ણલોહિતવર્ણવસનં
 પરિધાપયામાસુઃ 29 કાણ્ટકાનાં મુકુટં નિર્માય તચ્છિરસિ દદુઃ, તસ્ય
 દક્ષિણકરે વેત્રમેકં દત્વા તસ્ય સમ્મુખે જાનૂનિ પાતયિત્વા, હે ચિહ્નૂદીયાનાં
 રાજન્, તુભ્યં નમ ઇત્યુક્ત્વા તં તિરશ્ચક્રુઃ, 30 તતસ્તસ્ય ગાત્રે નિષ્ઠીવં દત્વા
 તેન વેત્રેણ શિર આજઘ્નુઃ | 31 ઇત્યં તં તિરસ્કૃત્ય તદ્ વસનં મોચયિત્વા
 પુનર્નિજવસનં પરિધાપયાઞ્ચક્રુઃ, તં ક્રુશેન વેધિતું નીતવન્તઃ | 32 પશ્ચાત્તે
 બહિર્ભૂચ કુરીણીયં શિમોન્નામકમેકં વિલોક્ય ક્રુશં વોદું તમાદદિરે | 33
 અનન્તરં ગુલ્ગલ્તામ્ અર્થાત્ શિરસ્કપાલનામકસ્થાનમુ પસ્થાય તે યીશવે
 પિત્તમિશ્રિતામ્બરસં પાતું દદુઃ, 34 કિન્તુ સ તમાસ્વાધ ન પપૌ | 35
 તદાનીં તે તં ક્રુશેન સંવિધ્ય તસ્ય વસનાનિ ગુટિકાપાતેન વિભજ્ય જગદ્ઃ,
 તસ્માત્, વિભજન્તેઽધરીયં મે તે મનુષ્યાઃ પરસ્પરં | મદુત્તરીયવસ્ત્રાર્થ
 ગુટિકાં પાતયન્તિ ચ | | યદેતદ્વચનં ભવિષ્યદ્વાદિભિરુક્તમાસીત્, તદા તદ્
 અસિધ્યત્, 36 પશ્ચાત્ તે તત્રોપવિશ્ય તદ્રક્ષણકર્વાણિ નિયુક્તાસ્તસ્થુઃ | 37
 અપરમ્ ઁષ ચિહ્નૂદીયાનાં રાજા યીશુરિત્યપવાદલિપિપત્રં તચ્છિરસ ઊર્દ્ધ્વે
 યોજયામાસુઃ | 38 તતસ્તસ્ય વામે દક્ષિણે ચ દ્વૌ ચૈરૌ તેન સાકં ક્રુશેન
 વિવિધુઃ | 39 તદા પાન્થા નિજશિરો લાઽયિત્વા તં નિન્દન્તો જગદ્ઃ, 40 હે

ઈશ્વરમન્દિરભઞ્જક દિનત્રયે તન્નિર્માતઃ સ્વં રક્ષ, ચેત્ત્વમીશ્વરસુતસ્તર્હિ
 કુશાદવરોહ | 41 પ્રધાનયાજકાધ્યાપકપ્રાચીનાશ્ચ તથા તિરસ્કૃત્ય જગદ્ગુઃ,
 42 સોડન્યજનાનાવત્, કિન્તુ સ્વમવિતું ન શક્નોતિ | યદીસ્રાયેલો રાજા
 ભવેત્, તર્હીદાનીમેવ કુશાદવરોહતુ, તેન તં વયં પ્રત્યેષ્યામઃ | 43 સ ઈશ્વરે
 પ્રત્યાશામકરોત્, યદીશ્વરસ્તસ્મિન્ સન્તુષ્ટસ્તર્હીદાનીમેવ તમવેત્, યતઃ સ
 ઉક્તવાન્ અહમીશ્વરસુતઃ | 44 યૌ સ્તેનૌ સાકં તેન કુશેન વિદ્વૌ તૌ તદ્વદેવ
 તં નિનિન્દતુઃ | 45 તદા દ્વિતીયયામાત્ તૃતીયયામં યાવત્ સર્વદેશે તમિરં
 ભભૂવ, 46 તૃતીયયામે "એલી એલી લામા શિવકતની", અર્થાત્ મદીશ્વર
 મદીશ્વર કુતો મામત્યાક્ષીઃ? યીશુરુચ્ચૈરિતિ જગાદ | 47 તદા તત્ર સ્થિતાઃ
 કેચિત્ તત્ શ્રુત્વા ભભાષિરે, અયમ્ એલિયમાહૂયતિ | 48 તેષાં મધ્યાદ્ એકઃ
 શીઘ્રં ગત્વા સ્પઞ્જં ગૃહીત્વા તત્રાભ્વરસં દત્વા નલેન પાતું તસ્મૈ દદૌ | 49
 ઇતરેડકથયન્ તિષ્ઠત, તં રક્ષિતુમ્ એલિય આયાતિ નવેતિ પશ્યામઃ | 50
 યીશુઃ પુનરુચૈરાહૂય પ્રાણાન્ જહી | 51 તતો મન્દિરસ્ય વિચ્છેદવસનમ્
 ઊર્દ્ધ્વાદધો યાવત્ છિધમાનં દ્વિધાભવત્, 52 ભૂમિશ્ચક્રમ્પે ભૂધરોવ્યદીર્યત
 ચ | શ્મશાને મુક્તે ભૂરિપુણ્યવતાં સુપ્તદેહા ઉદતિષ્ઠન્, 53 શ્મશાનાદ્
 વહિર્ભૂય તદુત્થાનાત્ પરં પુણ્યપુરં ગત્વા બહુજનાન્ દર્શયામાસુઃ | 54
 યીશુરક્ષાણાય નિયુક્તઃ શતસેનાપતિસ્તત્સક્તિનશ્ચ તાદૃશીં ભૂકમ્પાદિઘટનાં
 દૃષ્ટ્વા ભીતા અવદન્, એષ ઈશ્વરપુત્રો ભવતિ | 55 યા બહુયોષિતો યીશું
 સેવમાના ગાલીલસ્તત્પશ્ચાદાગતાસ્તાસાં મધ્યે 56 મગ્દલીની મરિયમ્
 યાહૂબ્યોશ્યો માર્તા યા મરિયમ્ સિબદિયપુત્રયો માર્તા ચ યોષિત એતા દૂરે
 તિષ્ઠન્ત્યો દદૃશુઃ | 57 સન્ધ્યાયાં સત્યમ્ અરિમથિયાનગરસ્ય યૂષ્કનામા
 ધની મનુજો યીશોઃ શિષ્યત્વાત્ 58 પીલાતસ્ય સમીપં ગત્વા યીશોઃ
 કાયં યયાચે, તેન પીલાતઃ કાયં દાતુમ્ આદિદેશ | 59 યૂષ્ક તત્કાયં
 નીત્વા શુચિવસ્ત્રેણાચ્છાધ 60 સ્વાર્થ શૈલે યત્ શ્મશાનં યખાન, તન્મધ્યે
 તત્કાયં નિધાય તસ્ય દ્વારિ વૃહત્પાષાણં દદૌ | 61 કિન્તુ મગ્દલીની
 મરિયમ્ અન્યમરિયમ્ એતે સ્ત્રિયૌ તત્ર શ્મશાનસમ્મુખ ઉપવિવિશતુઃ |
 62 તદનન્તરં નિસ્તારોત્સવસ્યાયોજનદિનાત્ પરેડહનિ પ્રધાનયાજકાઃ
 ફિરૂશિનશ્ચ મિલિત્વા પીલાતમુપાગત્યાકથયન્, 63 હે મહેચ્છ સ પ્રતારકો
 જીવન અકથયત્, દિનત્રયાત્ પરં શ્મશાનાદુત્થાસ્યામિ તદ્વાક્યં સ્મરામો વયં;

64 तस्मात् तृतीयदिनं यावत् तत् श्मशानं रक्षितुमादिशतु, नोयेत् तच्छिष्या
 यामिन्यामागत्य तं हत्वा लोकान् वदिष्यन्ति, स श्मशानाद्दुदतिष्ठत्, तथा
 सति प्रथमव्रान्तेः शेषीयव्रान्तिर्भङ्गती भविष्यति। 65 तदा पीलात
 अवादीत्, युष्माकं समीपे रक्षिगण आस्ते, यूयं गत्वा यथा साध्यं रक्षयत।
 66 ततस्ते गत्वा तदूरपाषाणं मुद्राङ्कितं कृत्वा रक्षिगणं नियोज्य श्मशानं
 रक्षयामासुः।

28 ततः परं विश्रामवारस्य शेषे सप्ताहप्रथमदिनस्य प्रभोते जाते
 भगवतीनी मरियम् अन्यमरियम् य श्मशानं द्रष्टुमागता। 2 तदा
 मडान् भूकम्पोऽभवत्; परमेश्वरीयदूतः स्वर्गादवरोह्य श्मशानद्वारात्
 पाषाणमपसार्य तदुपर्युपविवेश। 3 तद्दहनं विधुद्रत् तेजोमयं वसनं
 डिमशुभ्रम्। 4 तदानीं रक्षिगणस्तद्भयात् कम्पिता मृतवद् भूवः। 5 स दूतो
 योषितो जगाद्, यूयं मा भैष्ट, कुशडतयीशुं मृगयध्वे तददं वेदि। 6 सोऽत्र
 नास्ति, यथावदत् तथोत्थितवान्; अतत् प्रभोः शयनस्थानं पश्यत। 7 तूर्णं
 गत्वा तच्छिष्यान् षति वदत, स श्मशानाद् उदतिष्ठत्, युष्माकमत्रे गालीलं
 यास्यति यूयं तत्र तं वीक्षिष्यध्वे, पश्यतादं वार्ताभिमां युष्मानवादिषं। 8
 ततस्ता भयात् मडान्घ्राञ्च श्मशानात् तूर्णं अडिर्भूय तच्छिष्यान् वार्ता
 वक्तुं धावितवत्यः। किन्तु शिष्यान् वार्ता वक्तुं यान्ति, तदा यीशुर्दर्शनं दत्वा
 ता जगाद्, 9 युष्माकं कल्याणं भूयात्, ततस्ता आगत्य तत्पादयोः पतित्वा
 प्रणोमुः। 10 यीशुस्ता अवादीत्, मा भिभीत, यूयं गत्वा मम भ्रातृन् गालीलं
 यातुं वदत, तत्र ते मां द्रक्ष्यन्ति। 11 स्त्रियो गच्छन्ति, तदा रक्षिगणं केचित्
 पुरं गत्वा यद्घटितं तत्सर्व्वं प्रधानयाजकान् ज्ञापितवन्तः। 12 ते प्रायिनैः
 समं संसदं कृत्वा मन्त्रयन्तो अडुमुद्राः सेनाभ्यो दत्वावदन्, 13 अस्मासु
 निद्रितेषु तच्छिष्या यामिन्यामागत्य तं हत्वानयन्, षति यूयं प्रयास्यत। 14
 यधेतदधिपतेः श्रोत्रगोयरीभवेत्, तर्हि तं बोधयित्वा युष्मानविष्यामः। 15
 ततस्ते मुद्रा गृहीत्वा शिक्षानुत्पन्नं कर्म यक्नुः, यिडूदीयानां मध्ये तस्याधापि
 किंवदन्ती विधते। 16 अेकादश शिष्या यीशुनिर्दिष्टागालीलस्याद्रिं गत्वा
 17 तत्र तं संवीक्ष्य प्रणोमुः, किन्तु केचित् सन्दिग्धवन्तः। 18 यीशुस्तेषां
 समीपमागत्य व्याहृतवान्, स्वर्गभेदिन्योः सर्वाधिपतित्वभारो मय्यर्पित
 आस्ते। 19 अतो यूयं प्रयास्य सर्व्वदेशीयान् शिष्यान् कृत्वा पितुः पुत्रस्य

पवित्रस्यात्मनश्च नाम्ना तानवगाडयत; अहं युष्मान् यधदादिशं तदपि
पालयितुं तानुपादिशत | 20 पश्यत, जगदन्तं यावत् सदाहं युष्माभिः साकं
तिष्ठामि | इति | (aiōn g165)

भार्कः

1 ईश्वरपुत्रस्य यीशुःप्रीष्टस्य सुसंवादाभ्यः | 2 भविष्यद्वादिनां ग्रन्थेषु
लिपिरित्यभास्ते, पश्य स्वकीयदूतन्तु तवाग्रे प्रेषयाम्यहम् | गत्वा
त्वदीयपन्थानं स हि परिष्करिष्यति | 3 "परमेशस्य पन्थानं परिष्कुरुत
सर्वतः | तस्य राजपथञ्चैव समानं कुरुताधुना | " इत्येतत् प्रान्तरे
वाक्यं वदतः कस्यचिद्रवः | | 4 सञ्चेव योऽन् प्रान्तरे भञ्जितवान् तथा
पापमार्जननिमित्तं मनोव्यावर्तकमञ्जनस्य कथाञ्च प्रचारितवान् | 5
ततो यिहुदादेशयिःशालमनगरनिवासिनः सर्वे लोका बहिर्भूत्वा तस्य
समीपमागत्य स्वानि स्वानि पापान्यङ्गीकृत्य यद्दैनन्धां तेन भञ्जिता
बभूवुः | 6 अस्य योऽनः परिधेयानि कभेलकलोमजानि, तस्य कटिबन्धनं
यर्भञ्जितम्, तस्य लक्ष्याणि य शूककीटा वन्यमधूनि यासन् | 7 स
प्रचारयन् कथयाञ्चक्रे, अहं नम्रीभूय यस्य पादुकाबन्धनं मोचयितुमपि न
योग्योऽस्मि, तादृशो मत्तो गुरुतर अेकः पुरुषो मत्पश्चादागच्छति | 8 अहं
युष्मान् जले भञ्जितवान् किन्तु स पवित्र आत्मानि संभञ्जयिष्यति |
9 अपरञ्च तस्मिन्नेव काले गालीलप्रदेशस्य नासरद्ग्रामाद् यीशुरागत्य
योऽना यद्दैनन्धां भञ्जितोऽभूत् | 10 स जलाद्दुत्थितमात्रो मेघद्वारं
मुक्तं कपोतवत् स्वस्योपरि अवरोऽन्तमात्मानञ्च दृष्टवान् | 11 त्वं मम
प्रियः पुत्रस्त्वय्येव मममहासन्तोष इयमाकाशीया वाणी बभूव | 12
तस्मिन् काले आत्मा तं प्रान्तरमध्यं निनाय | 13 अथ स यत्वारिंशद्दिनानि
तस्मिन् स्थाने वन्यपशुभिः सह तिष्ठन् शैताना परीक्षितः; पश्चात्
स्वर्गीयदूतास्तं सिषेविरे | 14 अनन्तरं योऽनि बन्धनालये बद्धे सति
यीशुर्गालीलप्रदेशमागत्य ईश्वरराज्यस्य सुसंवाहं प्रचारयन् कथयामास,
15 कालः सम्पूर्णा ईश्वरराज्यञ्च समीपमागतं; अतोऽेतो र्युयं मनांसि
व्यावर्तयध्वं सुसंवाहे य विश्वासित | 16 तदनन्तरं स गालीलीयसमुद्रस्य
तीरे गच्छन् शिमोन् तस्य भ्राता अन्द्रियनामा य इमौ द्वौ जनौ मत्स्यधारिणौ
सागरमध्ये जालं प्रक्षिपन्तौ दृष्ट्वा तावदत्, 17 युवां मम पश्चादागच्छतं,
युवामहं मनुष्यधारिणौ करिष्यामि | 18 ततस्तौ तत्क्षणामेव जालानि
परित्यज्य तस्य पश्चात् जग्मतुः | 19 ततः परं तत्स्थानात् किञ्चिद्
दूरं गत्वा स सिवदीपुत्रयाङ्गुल् तद्भ्रातृयोऽन् य इमौ नौकायां जालानां

જીર્ણમુદ્ધારયન્તૌ દૃષ્ટ્વા તાવાહૂયત્ | 20 તતસ્તૌ નૌકાયાં વેતનભુગ્મિઃ સહિતં
 સ્વપિતરં વિહાય તત્પશ્ચાદીયતુઃ | 21 તતઃ પરં કઠ્ઠનાહૂન્મામકં નગરમુપસ્થાય
 સ વિશ્રામદિવસે ભજનગ્રહં પ્રવિશ્ય સમુપદિદેશ | 22 તસ્યોપદેશાલ્લોકા
 આશ્ચર્યં મેનિરે યતઃ સોધ્યાપકાઇવ નોપદિશન્ પ્રભાવવાનિવ પ્રોપદિદેશ |
 23 અપરઞ્ચ તસ્મિન્ ભજનગૃહે અપવિત્રભૂતેન ગ્રસ્ત એકો માનુષ આસીત્ |
 સ ચીત્શબ્દં કૃત્વા કથયાઞ્ચકે 24 ભો નાસરતીય ચીશો ત્વમસ્માન્ ત્યજ, ત્વયા
 સહાસ્માકં કઃ સમ્બન્ધઃ? ત્વં કિમસ્માન્ નાશયિતું સમાગતઃ? ત્વમીશ્વરસ્ય
 પવિત્રલોક ઇત્યહં જાનામિ | 25 તદા ચીશુસ્તં તર્જયિત્વા જગાદ તૂષ્ણી ભવ
 ઇતો બહિર્ભવ ય | 26 તતઃ સોડપવિત્રભૂતસ્તં સમ્પીડય અત્યુચૈશ્ચીત્કૃત્ય
 નિર્જગામ | 27 તેનૈવ સર્વે ચમત્કૃત્ય પરસ્પરં કથયાઞ્ચકિરે, અહો કિમિદં?
 કીદૃશોડયં નવ્ય ઉપદેશઃ? અનેન પ્રભાવેનાપવિત્રભૂતેષ્વાજ્ઞાપિતેષુ તે
 તદાજ્ઞાનુવર્તિનો ભવન્તિ | 28 તદા તસ્ય યશો ગાલીલશ્ચતુર્દિક્સ્થસર્વદેશાન્
 વ્યાપ્નોત્ | 29 અપરઞ્ચ તે ભજનગૃહાદ્ બહિર્ભૂત્વા યાકૂબ્યોહન્ત્યાં
 સહ શિમોન આન્દ્રિયસ્ય ય નિવેશનં પ્રવિવિશુઃ | 30 તદા પિતરસ્ય
 શ્વશ્રૂજર્વરપીડિતા શય્યાયામાસ્ત ઇતિ તે તં ઝટિતિ વિજ્ઞાપયાઞ્ચક્રુઃ | 31
 તતઃ સ આગત્ય તસ્યા હસ્તં ધૃત્વા તામુદસ્થાપયતુઃ તદૈવ તાં જવરોડત્યાક્ષીત્
 તતઃ પરં સા તાન્ સિષેવે | 32 અથાસ્તં ગતે રવૌ સન્ધ્યાકાલે સતિ
 લોકાસ્તત્સમીપં સર્વાન્ રોગિણો ભૂતધૃતાંશ્ચ સમાનિન્યુઃ | 33 સર્વે
 નાગરિકા લોકા દ્વારિ સંમિલિતાશ્ચ | 34 તતઃ સ નાનાવિધરોગિણો બહૂન્
 મનુજાનરોગિણાશ્ચકાર તથા બહૂન્ ભૂતાન્ ત્યાજયાઞ્ચકાર તાન્ ભૂતાન્
 કિમપિ વાક્યં વક્તું નિષિષેધ ય યતોહેતોસ્તે તમજાનન્ | 35 અપરઞ્ચ
 સોડતિપ્રત્યૂષે વસ્તુતસ્તુ રાત્રિશેષે સમુત્થાય બહિર્ભૂય નિર્જનં સ્થાનં ગત્વા
 તત્ર પ્રાર્થયાઞ્ચકે | 36 અનન્તરં શિમોન્ તત્સજ્ઞિનશ્ચ તસ્ય પશ્ચાદ્ ગતવન્તઃ |
 37 તદુદ્દેશં પ્રાપ્ય તમવદન્ સર્વે લોકાસ્ત્વાં મૃગયન્તે | 38 તદા સોડકથયત્
 આગચ્છત વયં સમીપસ્થાનિ નગરાણિ યામઃ, યતોડહં તત્ર કથાં પ્રચારયિતું
 બહિરાગમમ્ | 39 અથ સ તેષાં ગાલીલ્પ્રદેશસ્ય સર્વેષુ ભજનગૃહેષુ કથાઃ
 પ્રચારયાઞ્ચકે ભૂતાનત્યાજયઞ્ચ | 40 અનન્તરમેકઃ કુષ્ઠી સમાગત્ય તત્સમ્મુખે
 જાનુપાતં વિનયઞ્ચ કૃત્વા કથિતવાન્ યદિ ભવાન્ ઇચ્છતિ તર્હિ માં પરિષ્કર્તું
 શકન્નોતિ | 41 તતઃ કૃપાલુ ર્યીશુઃ કરૌ પ્રસાર્ય તં સ્પષ્ટ્વા કથયામાસ 42

મમેચ્છા વિધતે ત્વં પરિષ્કૃતો ભવ | એતત્કથાયાઃ કથનમાત્રાત્ સ કુષ્ઠી
 રોગાન્મુક્તઃ પરિષ્કૃતોઽભવત્ | 43 તદા સ તં વિસૃજન્ ગાઢમાદિશ્ય જગાદ
 44 સાવધાનો ભવ કથામિમાં કમપિ મા વદ; સ્વાત્માનં યાજકં દર્શય,
 લોકેભ્યઃ સ્વપરિષ્કૃતેઃ પ્રમાણદાનાય મૂસાનિર્ણીતં યદાનં તદુત્સૃજસ્વ ચ |
 45 કિન્તુ સ ગત્વા તત્ કર્મ ઇત્યં વિસ્તાર્ય પ્રચારયિતું પ્રારેભે તેનૈવ યીશુઃ
 પુનઃ સપ્રકાશં નગરં પ્રવેષ્ટું નાશકનોત્ તતોહેતોર્બહિઃ કાનનસ્થાને તસ્યૌ;
 તથાપિ ચતુર્દિગ્ભ્યો લોકાસ્તસ્ય સમીપમાયયુઃ |

2 તદનન્તરં યીશૌ કતિપયદિનાનિ વિલખ્ય પુનઃ કફર્નાહૂમ્નગરં પ્રવિષ્ટે સ ગૃહ
 આસ્ત ઇતિ કિંવદન્ત્યા તત્ક્ષણં તત્સમીપં બહવો લોકા આગત્ય સમુપતસ્યુઃ,
 2 તસ્માદ્ ગૃહમધ્યે સર્વેષાં કૃતે સ્થાનં નાભવદ્ દ્વારસ્ય ચતુર્દિક્ષવપિ નાભવત્,
 તત્કાલે સ તાન્ પ્રતિ કથાં પ્રચારયાઞ્ચકે | 3 તતઃ પરં લોકાશ્ચતુર્ભિર્માનવૈરેકં
 પક્ષાઘાતિનં વાહયિત્વા તત્સમીપમ્ આનિન્યુઃ | 4 કિન્તુ જનાનાં બહુત્વાત્ તં
 યીશોઃ સમ્મુખમાનેતું ન શકનુવન્તો યસ્મિન્ સ્થાને સ આસ્તે તદુપરિગૃહપૃષ્ઠં
 ખનિત્વા છિદ્રં કૃત્વા તેન માર્ગેણ સશય્યં પક્ષાઘાતિનમ્ અવરોહયામાસુઃ |
 5 તતો યીશુસ્તેષાં વિશ્વાસં દૃષ્ટ્વા તં પક્ષાઘાતિનં બભાષે હે વત્સ તવ
 પાપાનાં માર્જનં ભવતુ | 6 તદા કિયન્તોઽધ્યાપકાસ્તત્રોપવિશન્તો મનોભિ
 વિતર્કયાઞ્ચકુઃ, એષ મનુષ્ય એતાદૃશીમીશ્વરનિન્દાં કથાં કુતઃ કથયતિ? 7
 ઇશ્વરં વિના પાપાનિ માર્ઘુ કસ્ય સામર્થ્યમ્ આસ્તે? 8 ઇત્યં તે વિતર્કયન્તિ
 યીશુસ્તત્ક્ષણં મનસા તદ્ બુદ્ધ્વા તાનવદદ્ યૂયમન્તઃકરણૈઃ કુત એતાનિ
 વિતર્કયથ? 9 તદનન્તરં યીશુસ્તત્સ્થાનાત્ પુનઃ સમુદ્રતટં યયૌ; લોકનિવહે
 તત્સમીપમાગતે સ તાન્ સમુપદિદેશ | 10 કિન્તુ પૃથિવ્યાં પાપાનિ માર્ઘુ
 મનુષ્યપુત્રસ્ય સામર્થ્યમસ્તિ, એતદ્ યુષ્માન્ જ્ઞાપયિતું (સ તસ્મૈ પક્ષાઘાતિને
 કથયામાસ) 11 ઉત્તિષ્ઠ તવ શય્યાં ગૃહીત્વા સ્વગૃહં યાહિ, અહં ત્વામિદમ્
 આજ્ઞાપયામિ | 12 તતઃ સ તત્ક્ષણમ્ ઉત્થાય શય્યાં ગૃહીત્વા સર્વેષાં
 સાક્ષાત્ જગામ; સર્વે વિસ્મિતા એતાદૃશં કર્મ વયમ્ કદાપિ નાપશ્યામ,
 ઇમાં કથાં કથયિત્વેશ્વરં ધન્યમબ્રુવન્ | 13 તદનન્તરં યીશુસ્તત્સ્થાનાત્ પુનઃ
 સમુદ્રતટં યયૌ; લોકનિવહે તત્સમીપમાગતે સ તાન્ સમુપદિદેશ | 14 અથ
 ગચ્છન્ કરસઞ્ચયગૃહ ઉપવિષ્ટમ્ આલ્હીયપુત્રં લેવિં દૃષ્ટ્વા તમાહૂય કથિતવાન્
 મત્પશ્યાત્ ત્વામામચ્છ તતઃ સ ઉત્થાય તત્પશ્યાદ્ યયૌ | 15 અનન્તરં યીશૌ

तस्य गृहे भोक्तुम् उपविष्टे बहवः करमञ्जायिनः पापिनश्च तेन तच्छिष्यैश्च
सखोपविशुः, यतो बहवस्तत्पश्चादाजग्मुः | 16 तदा स करमञ्जायिभिः
पापिभिश्च सह भ्रातृ, तद् दृष्ट्वाध्यापकाः द्विःशिनश्च तस्य शिष्यानूयुः
करमञ्जायिभिः पापिभिश्च सहायं कुतो भुङ्क्ते पिवति य? 17 तद्वाक्यं
श्रुत्वा यीशुः प्रत्युवाच, अरोगिलोकानां चिकित्सकेन प्रयोजनं नास्ति, किन्तु
रोगिणामेव; अहं धार्मिकानां ह्यातुं नागतः किन्तु मनो व्यावर्तयितुं पापिन
मेव | 18 ततः परं योहनः द्विःशिनाओपवासायारिशिष्या यीशोः समीपम्
आगत्य कथयामासुः, योहनः द्विःशिनाओ शिष्या उपवसन्ति किन्तु भवतः
शिष्या नोपवसन्ति किं कारणमस्य? 19 तदा यीशुस्तान् ब्रुवाणो यावत् कालं
सन्निभिः सह कन्याया वरस्तिष्ठति तावत्कालं ते किमुपवस्तुं शक्नुवन्ति?
यावत्कालं वरस्तैः सह तिष्ठति तावत्कालं त उपवस्तुं न शक्नुवन्ति | 20
यस्मिन् काले तेभ्यः सकाशाद् वरो नेष्यते स काल आगच्छति, तस्मिन् काले
ते जना उपवसन्ति | 21 कोपि जनः पुरातनवस्त्रे नूतनवस्त्रं न सीव्यति,
यतो नूतनवस्त्रेण सह सेवने कृते शोभं वस्त्रं छिद्यते तस्मात् पुनर्भूय
छिद्रं जायते | 22 कोपि जनः पुरातनकुतूषु नूतनं द्राक्षारसं न स्थापयति,
यतो नूतनद्राक्षारसस्य तेजसा ताः कुत्वो विदीर्यन्ते ततो द्राक्षारसश्च पतति
कुत्वश्च नश्यन्ति, अतमेव नूतनद्राक्षारसो नूतनकुतूषु स्थापनीयः | 23
तदनन्तरं यीशु र्यदा विश्रामवारे शस्यक्षेत्रेण गच्छति तदा तस्य शिष्या
गच्छन्तः शस्यमञ्जरीश्लेत्तुं प्रवृत्ताः | 24 अतः द्विःशिनो यीशवे कथयामासुः
पश्यतु विश्रामवासरे यत् कर्म न कर्तव्यं तद् एभे कुतः कुर्वन्ति? 25
तदा स तेभ्योऽकथयत् दायूद् तत्संज्ञिनश्च भक्ष्याभावात् क्षुधिताः सन्तो
यत् कर्म कृतवन्तस्तत् किं युष्माभिर्न पठितम्? 26 अबिधाथर्नाभिके
महायाजकतां कुर्वन्ति स कथमीश्वरस्यावासं प्रविश्य ये दर्शनीयपूपा
याजकान् विनान्यस्य कस्यापि न भक्ष्यास्तानेव बुभुजे सङ्गिलोकेभ्योऽपि
ददौ | 27 सोऽपरमपि जगाद, विश्रामवारो मनुष्यार्थमेव निरूपितोऽस्ति
किन्तु मनुष्यो विश्रामवारार्थं नैव | 28 मनुष्यपुत्रो विश्रामवारस्यापि
प्रभुरास्ते |

3 अनन्तरं यीशुः पुनर्भोजनगृहं प्रविष्टस्तस्मिन् स्थाने शुष्कस्त अको
मानव आसीत् | 2 स विश्रामवारे तमरोगिणं करिष्यति नवेत्यत्र बहवस्तम्

અપવદિતું છિદ્રમપેક્ષિતવન્તઃ | 3 તદા સ તં શુષ્કહસ્તં મનુષ્યં જગાદ
 મધ્યસ્થાને ત્વમુત્તિષ્ઠ | 4 તતઃ પરં સ તાન્ પપ્રચ્છ વિશ્રામવારે હિતમહિતં
 તથા હિ પ્રાણરક્ષા વા પ્રાણનાશ એષાં મધ્યે કિં કરણીયં? કિન્તુ તે
 નિઃશબ્દાસ્તસ્થુઃ | 5 તદા સ તેષામન્તઃકરણાનાં કાઠિન્યાદ્વેતો દુઃખિતઃ
 ક્રોધાત્ ચર્તુદ્દશો દૃષ્ટવાન્ તં માનુષં ગદિતવાન્ તં હસ્તં વિસ્તારય, તતસ્તેન
 હસ્તે વિસ્તૃતે તદ્વસ્તોડન્યહસ્તવદ્ અરોગો જાતઃ | 6 અથ ક્ષિરશિનઃ પ્રસ્થાય
 તં નાશયિતું હેરોદીયૈઃ સહ મન્ત્રયિતુમારેભિરે | 7 અતએવ યીશુસ્તત્સ્થાનં
 પરિત્યજ્ય શિષ્યૈઃ સહ પુનઃ સાગરસમીપં ગતઃ; 8 તતો ગાલીલ્થિહૂદા-
 યિરૂશાલમ્-ઇદોમ્-ચર્દન્નદીપારસ્થાનેભ્યો લોકસમૂહસ્તસ્ય પશ્ચાદ્ ગતઃ;
 તદન્યઃ સોરસીદનોઃ સમીપવાસિલોકસમૂહશ્ચ તસ્ય મહાકર્મણાં વાર્તા
 શ્રુત્વા તસ્ય સન્નિધિમાગતઃ | 9 તદા લોકસમૂહશ્ચેત્ તસ્યોપરિ પતતિ
 ઇત્યાશઙ્ક્ય સ નાવમેકાં નિકટે સ્થાપયિતું શિષ્યાનાદિષ્ટવાન્ | 10
 યતોડનેકમનુષ્યાણામારોગ્યકરણાદ્ વ્યાધિગ્રસ્તાઃ સર્વે તં સ્પ્રષ્ટું પરસ્પરં
 બલેન યત્નવન્તઃ | 11 અપરઞ્ચ અપવિત્રભૂતાસ્તં દૃષ્ટ્વા તચ્ચરણયોઃ પતિત્વા
 પ્રોચૈઃ પ્રોચુઃ, ત્વમીશ્વરસ્ય પુત્રઃ | 12 કિન્તુ સ તાન્ દૃઢમ્ આજ્ઞાપ્ય સ્વં
 પરિચાયિતું નિષિદ્ધવાન્ | 13 અનન્તરં સ પર્વતમારુહ્ય યં યં પ્રતિચ્છા તં
 તમાહૂતવાન્ તતસ્તે તત્સમીપમાગતાઃ | 14 તદા સ દ્વાદશજનાન્ સ્વેન સહ
 સ્થાતું સુસંવાદપ્રચારાય પ્રેરિતા ભવિતું 15 સર્વપ્રકારવ્યાધીનાં શમનકરણાય
 પ્રભાવં પ્રાપ્તું ભૂતાન્ ત્યાજયિતુઞ્ચ નિયુક્તવાન્ | 16 તેષાં નામાનીમાનિ,
 શિમોન્ સિવદિપુત્રો 17 યાકૂબ્ તસ્ય ભ્રાતા યોહન્ ય આન્દ્રિયઃ ક્ષિલિપો
 બર્થલમયઃ, 18 મથી થોમા ય આલ્ફીયપુત્રો યાકૂબ્ થદ્દીયઃ કિનાનીયઃ
 શિમોન્ યસ્તં પરહસ્તેષ્વર્પયિષ્યતિ સ ઈષ્કરિયોતીયયિહૂદાશ્ચ | 19 સ
 શિમોને પિતર ઇત્યુપનામ દદૌ યાકૂબ્યોહન્ભ્યાં ય બિનેરિગિશ્ અર્થતો
 મેઘનાદપુત્રાવિત્યુપનામ દદૌ | 20 અનન્તરં તે નિવેશનં ગતાઃ, કિન્તુ
 તત્રાપિ પુનર્મહાન્ જનસમાગમો ડભવત્ તસ્માત્તે ભોક્તુમપ્યવકાશં ન
 પ્રાપ્તાઃ | 21 તતસ્તસ્ય સુહલ્લોકા ઇમાં વાર્તા પ્રાપ્ય સ હતજ્ઞાનોભૂદ્ ઇતિ
 કથાં કથયિત્વા તં ધૃત્વાનેતું ગતાઃ | 22 અપરઞ્ચ યિરૂશાલમ આગતા યે
 યેડધ્યાપકાસ્તે જગદુરયં પુરુષો ભૂતપત્યાબિષ્ટસ્તેન ભૂતપતિના ભૂતાન્
 ત્યાજયતિ | 23 તતસ્તાનાહૂય યીશુ દૃષ્ટાન્તૈઃ કથાં કથિતવાન્ શૈતાન્ કથં

શૈતાનં ત્યાજયિતું શકનોતિ? 24 કિઞ્ચન રાજ્યં યદિ સ્વવિરોધેન પૃથગ્ ભવતિ તર્હિ તદ્ રાજ્યં સ્થિરં સ્થાતું ન શકનોતિ | 25 તથા કસ્યાપિ પરિવારો યદિ પરસ્પરં વિરોધી ભવતિ તર્હિ સોપિ પરિવારઃ સ્થિરં સ્થાતું ન શકનોતિ | 26 તદ્વત્ શૈતાન્ યદિ સ્વવિપક્ષતયા ઉત્તિષ્ઠન્ ભિન્નો ભવતિ તર્હિ સોપિ સ્થિરં સ્થાતું ન શકનોતિ કિન્તૂચ્છિન્નો ભવતિ | 27 અપરઞ્ પ્રબલં જનં પ્રથમં ન બદ્ધા કોપિ તસ્ય ગૃહં પ્રવિશ્ય દ્રવ્યાણિ લુણ્ઠયિતું ન શકનોતિ, તં બદ્ધવૈવ તસ્ય ગૃહસ્ય દ્રવ્યાણિ લુણ્ઠયિતું શકનોતિ | 28 અતોહેતો યુષ્મભ્યમહં સત્યં કથયામિ મનુષ્યાણાં સન્તાના યાનિ યાનિ પાપાનીશ્વરનિન્દાઞ્ કુર્વન્તિ તેષાં તત્સર્વેષામપરાધાનાં ક્ષમા ભવિતું શકનોતિ, 29 કિન્તુ યઃ કશ્ચિત્ પવિત્રમાત્માનં નિન્દતિ તસ્યાપરાધસ્ય ક્ષમા કદાપિ ન ભવિષ્યતિ સોનન્તદાણ્ડસ્યાહો ભવિષ્યતિ | (aiōn g165, aiōnios g166) 30 તસ્યાપવિત્રભૂતોઽસ્તિ તેષામેતત્કથાહેતોઃ સ ઇત્યં કથિતવાન્ | 31 અથ તસ્ય માતા ભ્રાતૃગણાશ્રાગત્ય બહિસ્તિષ્ઠનતો લોકાન્ પ્રેષ્ય તમાહૂતવન્તઃ | 32 તતસ્તત્સન્નિઘૌ સમુપવિષ્ટા લોકાસ્તં બભાષિરે પશ્ય બહિસ્તવ માતા ભ્રાતરશ્ચ ત્વામ્ અન્વિચ્છન્તિ | 33 તદા સ તાન્ પ્રત્યુવાચ મમ માતા કા ભ્રાતરો વા કે? તતઃ પરં સ સ્વમીપોપવિષ્ટાન્ શિષ્યાન્ પ્રતિ અવલોકનં કૃત્વા કથયામાસ 34 પશ્યતૈતે મમ માતા ભ્રાતરશ્ચ | 35 યઃ કશ્ચિદ્ ઇશ્વરસ્યેષ્ટાં ક્રિયાં કરોતિ સ એવ મમ ભ્રાતા ભગિની માતા ચ |

4 અનન્તરં સ સમુદ્રતટે પુનરુપદેષ્ટું પ્રારેભે, તતસ્તત્ર બહુજનાનાં સમાગમાત્ સ સાગરોપરિ નૌકામારુઠ્ઠ સમુપવિષ્ટઃ; સર્વે લોકાઃ સમુદ્રકૂલે તસ્થુઃ | 2 તદા સ દૃષ્ટાન્તકથાભિ ભૂંડૂપદિષ્ટવાન્ ઉપદિશંશ્ચ કથિતવાન્, 3 અવધાનં કુરુત, એકો બીજવપ્તા બીજાનિ વપ્તું ગતઃ; 4 વપનકાલે કિયન્તિ બીજાનિ માર્ગપાશ્વે પતિતાનિ, તત આકાશીયપક્ષિણ એત્ય તાનિ ચખ્માદુઃ | 5 કિયન્તિ બીજાનિ સ્વલ્પમૃત્તિકાવત્પાષાણભૂમૌ પતિતાનિ તાનિ મૃદોલ્પત્વાત્ શીઘ્રમકુરિતાનિ; 6 કિન્તૂદિતે સૂર્યે દગ્ધાનિ તથા મૂલાનો નાધોગતત્વાત્ શુષ્કાણિ ચ | 7 કિયન્તિ બીજાનિ કણ્ટકિવનમધ્યે પતિતાનિ તતઃ કણ્ટકાનિ સંવૃદ્ધ્ય તાનિ જગ્રસુસ્તાનિ ન ચ ફલિતાનિ | 8 તથા કિયન્તિ બીજાન્યુત્તમભૂમૌ પતિતાનિ તાનિ સંવૃદ્ધ્ય ફલાન્યુત્પાદિતાનિ કિયન્તિ બીજાનિ ત્રિંશદ્ગુણાનિ કિયન્તિ ષષ્ટિગુણાનિ કિયન્તિ શતગુણાનિ ફલાનિ

इलितवन्ति | 9 अथ स तानवदत् यस्य श्रोतुं कर्णौ स्तः स शृणोतु | 10
 तदनन्तरं निर्जनसमये तत्सङ्गिनो द्वादशशिष्याश्च तं तद्दृष्टान्तवाक्यस्यार्थं
 पप्रच्छुः | 11 तदा स तानुदितवान् षड्वराज्यस्य निगूढवाक्यं बोद्धुं
 युष्माकमधिकारोऽस्ति; 12 किन्तु ये वडिर्भूताः "ते पश्यन्तः पश्यन्ति किन्तु
 न जानन्ति, शृण्वन्तः शृण्वन्ति किन्तु न बुध्यन्ते, येतै र्भनःसु कदापि
 परिवर्तितेषु तेषां पापान्यभोययिष्यन्त," अतोऽेतोस्तान् प्रति दृष्टान्तैरेव
 तानि मया कथितानि | 13 अथ स कथितवान् यूयं किमेतद् दृष्टान्तवाक्यं
 न बुध्यध्वे? तर्हि कथं सर्वान् दृष्टान्तान् लोत्स्यध्वे? 14 बीजवप्ता
 वाक्यरूपाणि बीजानि वपति; 15 तत्र ये ये लोका वाक्यं शृण्वन्ति, किन्तु
 श्रुतमात्रात् शैतान् शीघ्रमागत्य तेषां मनःसूप्तानि तानि वाक्यरूपाणि
 बीजान्यपनयति तथेव उप्तबीजमार्गपार्श्वस्वरूपाः | 16 ये जना वाक्यं
 श्रुत्वा सलसा परमानन्देन गृह्णन्ति, किन्तु हृदि स्थैर्याभावात् किञ्चित्
 कालमात्रं तिष्ठन्ति तत्पश्चात् तद्वाक्यदेतोः 17 कुत्रयित् क्लेशे उपद्रवे वा
 समुपस्थिते तदैव विघ्नं प्राप्नुवन्ति तथेव उप्तबीजपाषाणभूमिस्वरूपाः |
 18 ये जनाः कथां शृण्वन्ति किन्तु सांसारिकी यिन्ता धनत्रान्ति विषयलोभश्च
 अते सर्वे उपस्थाय तां कथां ग्रसन्ति ततः मा विङ्गला भवति (aiōn g165) 19
 तथेव उप्तबीजसकण्टकभूमिस्वरूपाः | 20 ये जना वाक्यं श्रुत्वा गृह्णन्ति
 तेषां कस्य वा त्रिंशद्गुणानि कस्य वा षष्टिगुणानि कस्य वा शतगुणानि
 इलानि भवन्ति तथेव उप्तबीजोर्वरभूमिस्वरूपाः | 21 तदा सोऽपरमपि
 कथितवान् कोपि जनो दीपाधारं परित्यज्य द्रोणस्याधः षड्वाया अधे वा
 स्थापयितुं दीपमानयति किं? 22 अतोऽेतो र्यन्न प्रकाशयिष्यते तादृग्
 लुक्कायितं किमपि वस्तु नास्ति; यद् व्यक्तं न भविष्यति तादृशं गुप्तं
 किमपि वस्तु नास्ति | 23 यस्य श्रोतुं कर्णौ स्तः स शृणोतु | 24 अपरमपि
 कथितवान् यूयं यद् यद् वाक्यं शृणुथ तत्र सावधाना भवत, यतो यूयं येन
 परिमाणेन परिमाथ तेनैव परिमाणेन युष्मदर्थमपि परिमास्यते; श्रोतारो
 यूयं युष्मदर्थमधिकं दास्यते | 25 यस्याश्रये वर्द्धते तस्मै अपरमपि दास्यते,
 किन्तु यस्याश्रये न वर्द्धते तस्य यत् किञ्चिदस्ति तदपि तस्मान् नेष्यते | 26
 अनन्तरं स कथितवान् अको लोकः क्षेत्रे बीजान्युत्वा 27 जगरणनिद्राभ्यां
 द्विवानिशं गमयति, परन्तु तद्बीजं तस्याज्ञातरूपेणाङ्कुरयति वर्द्धते यः 28

यतोऽहेतोः प्रथमतः पत्राणि ततः परं कण्डिशानि तत्पश्चात् कण्डिशपूर्यानि
 शस्यानि भूमिः स्वयमुत्पाद्यति; 29 किन्तु इलेषु पङ्केषु शस्यच्छेदनकालं
 ज्ञात्वा स तत्क्षणां शस्यानि छिनत्ति, अनेन तुल्यमीश्वरराज्यं। 30 पुनः
 सोऽकथयद् ईश्वरराज्यं केन समं? केन वस्तुना सः वा तदुपमास्यामि? 31
 तत् सर्षपैकेन तुल्यं यतो मृदि वपनकाले सर्षपबीजं सर्व्वपृथिवीस्थबीजात्
 क्षुद्रं 32 किन्तु वपनात् परम् अङ्कुरयित्वा सर्व्वशाकाद् बृहद् भवति,
 तस्य बृहत्त्यः शाभाश्च जायन्ते ततस्तच्छायां पक्षिण आश्रयन्ते। 33
 एत्थं तेषां बोधानुसृपं सोऽनेकदृष्टान्तैस्तानुपदिष्टवान्, 34 दृष्टान्तं विना
 कामपि कथां तेभ्यो न कथितवान् पश्चान् निर्जने स शिष्यान् सर्व्वदृष्टान्तार्थं
 बोधितवान्। 35 तद्दिनस्य सन्ध्यायां स तेभ्योऽकथयद् आगच्छत वयं पारं
 याम्। 36 तदा ते लोकान् विसृज्य तमविलम्बं गृहीत्वा नौकया प्रतस्थिरे;
 अपरा अपि नावस्तथा सः स्थिताः। 37 ततः परं महाजम्भशगमात्
 नौ ईलायमाना तरङ्गेषु जलैः पूर्याभवय्य। 38 तदा स नौकायश्चाद्वागे
 उपधाने शिरो निधाय निद्रित आसीत् ततस्ते तं जागरयित्वा जगद्गुः,
 हे प्रभो, अस्माकं प्राणा यान्ति किमत्र भवतश्चिन्ता नास्ति? 39 तदा
 स उत्थाय वायुं तर्जितवान् समुद्रोक्तवान् शान्तः सुस्थिरश्च भव;
 ततो वायौ निवृत्तेऽब्धिर्निस्तरङ्गोऽभूत्। 40 तदा स तानुवाय यूयं कुत
 अेतादृक्शङ्काकुला भवत? किं वो विश्वासो नास्ति? 41 तस्मात्तेऽतीवभीताः
 परस्परं वक्तुमारंभिरे, अहो वायुः सिन्धुश्चास्य निदेशग्राहिणौ कीदृगयं
 मनुजः।

5 अथ तू सिन्धुपारं गत्वा गिरेरीयप्रदेशे उपतस्थुः। 2 नौकातो
 निर्गतमात्राद् अपवित्रभूतग्रस्त अेकः श्मशानादेत्य तं साक्षाय् यकार। 3
 स श्मशानेऽवात्सीत् कोपि तं शृङ्खलेन बद्ध्वा स्थापयितुं नाशक्तोत्।
 4 जनैर्वारं निगडैः शृङ्खलैश्च स बद्धोपि शृङ्खलान्याकृष्य मोयितवान्
 निगडानि य बन्धत्वा भ्रष्टं भ्रष्टं कृतवान् कोपि तं वशीकर्तुं न शक्तः। 5
 द्विवानिशं सदा पर्व्वतं श्मशानञ्च भ्रमित्वा यीत्शब्दं कृतवान् ग्रावभिश्च
 स्वयं स्वं कृतवान्। 6 स यीशुं दूरात् पश्यन्नेव धावन् तं प्राणनाम
 उर्यैरुर्वंश्रोवाय, 7 हे सर्व्वोपरिस्थेश्वरपुत्र यीशो भवता सः मे कः
 सम्बन्धः? अहं त्वामीश्वरेण शापये मां मा यातय। 8 यतो यीशुस्तं

કથિતવાન્ રે અપવિત્રભૂત, અસ્માન્નરાદ્ બહિર્નિર્ગચ્છ | 9 અથ સ
 તં પૃષ્ઠવાન્ કિન્તે નામ? તેન પ્રત્યુક્તં વયમનેકે ડસ્મસ્તતોડસ્મન્નામ
 બાહિની | 10 તતોસ્માન્ દેશાન્ન પ્રેષયેતિ તે તં પ્રાર્થયન્ત | 11
 તદાનીં પર્વતં નિકષા બૃહન્ વરાહવ્રજશ્ચરન્નાસીત્ | 12 તસ્માદ્ ભૂતા
 વિનયેન જગદુઃ, અમું વરાહવ્રજમ્ આશ્રયિતુમ્ અસ્માન્ પ્રહિણુ | 13
 યીશુનાનુજ્ઞાતાસ્તેડપવિત્રભૂતા બહિર્નિર્યાય વરાહવ્રજં પ્રાવિશન્ તતઃ સર્વે
 વરાહા વસ્તુતસ્તુ પ્રાયોદ્વિસહસ્રસંહ્યકાઃ કટકેન મહાજવાદ્ ધાવન્તઃ
 સિન્ધૌ પ્રાણાન્ જહુઃ | 14 તસ્માદ્ વરાહપાલકાઃ પલાયમાનાઃ પુરે ગ્રામે
 ય તદ્ધાર્ત કથયાઞ્ચક્રુઃ | તદા લોકા ઘટિતં તત્કાર્યં દ્રષ્ટું બહિર્જગ્મુઃ 15
 યીશોઃ સન્નિધિં ગત્વા તં ભૂતગ્રસ્તમ્ અર્થાદ્ બાહિનીભૂતગ્રસ્તં નરં સવસ્ત્રં
 સચેતનં સમુપવિષ્ટઞ્ચ દૃષ્ટ્વા ભિભ્યુઃ | 16 તતો દૃષ્ટતત્કાર્યલોકાસ્તસ્ય
 ભૂતગ્રસ્તનરસ્ય વરાહવ્રજસ્યાપિ તાં ઘટનાં વર્ણયામાસુઃ | 17 તતસ્તે
 સ્વસીમાતો બહિર્ગન્તું યીશું વિનેતુમારેભિરે | 18 અથ તસ્ય નૌકારોહણકાલે
 સ ભૂતમુક્તો ના યીશુના સહ સ્થાતું પ્રાર્થયતે; 19 કિન્તુ સ તમનનુમત્ય
 કથિતવાન્ ત્વં નિજાત્મીયાનાં સમીપં ગૃહ્ણ ગચ્છ પ્રભુસ્ત્વયિ કૃપાં કૃત્વા
 યાનિ કર્મ્માણિ કૃતવાન્ તાનિ તાન્ જ્ઞાપય | 20 અતઃ સ પ્રસ્થાય યીશુના કૃતં
 તત્સર્વાશ્રયં કર્મ દિકાપલિદેશે પ્રચારયિતું પ્રારબ્ધવાન્ તતઃ સર્વે લોકા
 આશ્રયં મેનિરે | 21 અનન્તરં યીશૌ નાવા પુનરન્યપાર ઉત્તીર્ણે સિન્ધુતટે ય
 તિષ્ઠતિ સતિ તત્સમીપે બહુલોકાનાં સમાગમોડભૂત્ | 22 અપરં યાચીર્
 નામ્ના કશ્ચિદ્ ભજનગૃહસ્યાધિપ આગત્ય તં દૃષ્ટ્વૈવ ચરણયોઃ પતિત્વા બહુ
 નિવેધ કથિતવાન્; 23 મમ કન્યા મૃતપ્રાયાભૂદ્ અતો ભવાનેત્ય તદારોગ્યાય
 તસ્યા ગાત્રે હસ્તમ્ અર્પયતુ તેનૈવ સા જીવિષ્યતિ | 24 તદા યીશુસ્તેન
 સહ ચલિતઃ કિન્તુ તત્પશ્ચાદ્ બહુલોકાશ્ચલિત્વા તાદ્ગાત્રે પતિતાઃ | 25 અથ
 દ્વાદશવર્ષાણિ પ્રદરરોગેણ 26 શીર્ણા ચિકિત્સકાનાં નાનાચિકિત્સાભિશ્ચ દુઃખં
 ભુક્તવતી ય સર્વસ્વં વ્યયિત્વાપિ નારોગ્યં પ્રાપ્તા ય પુનરપિ પીડિતાસીચ્ચ
 27 યા સ્ત્રી સા યીશો વર્તાર્તા પ્રાપ્ય મનસાકથયત્ યદહં તસ્ય વસ્ત્રમાત્ર
 સ્પૃષ્ટું લભેયં તદા રોગહીના ભવિષ્યામિ | 28 અતોહેતોઃ સા લોકારણ્યમધ્યે
 તત્પશ્ચાદાગત્ય તસ્ય વસ્ત્રં પસ્પર્શ | 29 તેનૈવ તત્ક્ષણં તસ્યા રક્તસ્રોતઃ
 શુષ્કં સ્વયં તસ્માદ્ રોગાન્મુક્તા ઇત્યપિ દેહેડનુભૂતા | 30 અથ સ્વસ્માત્

શક્તિ નિર્ગતા યીશુરેતન્મનસા જ્ઞાત્વા લોકનિવહં પ્રતિ મુખં વ્યાવૃત્ય
 પૃષ્ટવાન્ કેન મદ્વસ્ત્રં સ્પૃષ્ટ? 31 તતસ્તસ્ય શિષ્યા ઊચુઃ ભવતો વપુષિ લોકાઃ
 સંઘર્ષન્તિ તદ્ દૃષ્ટ્વા કેન મદ્વસ્ત્રં સ્પૃષ્ટમિતિ કુતઃ કથયતિ? 32 કિન્તુ કેન તત્
 કર્મ્મ કૃતં તદ્ દ્રષ્ટું યીશુશ્ચતુર્દિશો દૃષ્ટવાન્ | 33 તતઃ સા સ્ત્રી ભીતા કમ્પિતા
 ચ સતી સ્વસ્યા રુકપ્રતિક્રિયા જાતેતિ જ્ઞાત્વાગત્ય તત્સમ્મુખે પતિત્વા
 સર્વવૃત્તાન્તં સત્યં તસ્મૈ કથયામાસ | 34 તદાનીં યીશુસ્તાં ગદિતવાન્, હે
 કન્યે તવ પ્રતીતિસ્ત્વામ્ અરોગામકરોત્ ત્વં ક્ષેમોણ વ્રજ સ્વરોગાન્મુક્તા
 ચ તિષ્ઠ | 35 ઇતિવાક્યવદનકાલે ભજનગૃહાધિપસ્ય નિવેશનાલ્ લોકા
 એત્યાધિપં બભાષિરે તવ કન્યા મૃતા તસ્માદ્ ગુરુઃ પુનઃ કુતઃ ક્લિશ્નાસિ?
 36 કિન્તુ યીશુસ્તદ્ વાક્યં શ્રુત્વૈવ ભજનગૃહાધિપં ગદિતવાન્ મા ભૈષીઃ
 કેવલં વિશ્વાસિહિ | 37 અથ પિતરો યાકૂબ્ તદ્ભ્રાતા યોહન્ ચ એતાન્
 વિના કમપિ સ્વપશ્ચાદ્ યાતું નાન્વમન્યત | 38 તસ્ય ભજનગૃહાધિપસ્ય
 નિવેશનસમીપમ્ આગત્ય કલહં બહુરોદનં વિલાપન્ કુર્વ્યતો લોકાન્ દદર્શ |
 39 તસ્માન્ નિવેશનં પ્રવિશ્ય પ્રોક્તવાન્ યૂયં કુત ઇત્યં કલહં રોદનન્ કુરુથ?
 કન્યા ન મૃતા નિદ્રાતિ | 40 તસ્માત્તે તમુપજહસુઃ કિન્તુ યીશુઃ સર્વાન્
 બહિષ્કૃત્ય કન્યાયાઃ પિતરૌ સ્વસક્લિનશ્ચ ગૃહીત્વા યત્ર કન્યાસીત્ તત્ સ્થાનં
 પ્રવિષ્ટવાન્ | 41 અથ સ તસ્યાઃ કન્યાયા હસ્તૌ ધૃત્વા તાં બભાષે ટાલીથા
 કૂમ્બી, અર્થતો હે કન્યે ત્વમુત્તિષ્ઠ ઇત્યાજ્ઞાપયામિ | 42 તુનૈવ તત્ક્ષણં સા
 દ્વાદશવર્ષવયસ્કા કન્યા પોત્યાય ચલિતુમારેભે, ઇતઃ સર્વ્વ મહાવિસ્મયં
 ગતાઃ | 43 તત એતસ્યૈ કિઞ્ચિત્ ખાધં દત્તેતિ કથયિત્વા એતત્કર્મ્મ કમપિ ન
 જ્ઞાપયતેતિ દૃઢમાદિષ્ટવાન્ |

6 અનન્તરં સ તત્સ્થાનાત્ પ્રસ્થાય સ્વપ્રદેશમાગતઃ શિષ્યાશ્ચ તત્પશ્ચાદ્
 ગતાઃ | 2 અથ વિશ્રામવારે સતિ સ ભજનગૃહે ઉપદેષ્ટુમારબ્ધવાન્ તતોડનેકે
 લોકાસ્તત્કથાં શ્રુત્વા વિસ્મિત્ય જગદુઃ, અસ્ય મનુજસ્ય ઇદૃશી આશ્ચર્યક્રિયા
 કસ્માજ્ જાતા? તથા સ્વકરાભ્યામ્ ઇત્યમદ્ભુતં કર્મ્મ કર્તામ્ એતસ્મૈ કથં
 જ્ઞાનં દત્તમ્? 3 કિમયં મરિચમઃ પુત્રસ્તજ્ઞા નો? કિમયં યાકૂબ્-યોસિ-ચિહુદા-
 શિમોનાં ભ્રાતા નો? અસ્ય ભગિન્યઃ કિમિહાસ્માભિઃ સહ નો? ઇત્યં તે
 તદર્થે પ્રત્યૂહં ગતાઃ | 4 તદા યીશુસ્તેભ્યોડકથયત્ સ્વદેશં સ્વકુટુમ્બાન્
 સ્વપરિજનાંશ્ચ વિના કુત્રાપિ ભવિષ્યદ્વાદી અસત્કૃતો ન ભવતિ | 5 અપરઞ્ચ

તેષામપ્રત્યયાત્ સ વિસ્મિતઃ કિયતાં રોગિણાં વપુઃષુ હસ્તમ્ અર્પયિત્વા
 કેવલં તેષામારોગ્યકરણાદ્ અન્યત્ કિમપિ ચિત્રકાર્ય્યં કર્તાં ન શક્તઃ |
 6 અથ સ ચતુર્દિક્સ્થ ગ્રામાન્ ભ્રમિત્વા ઉપદિષ્ટવાન્ 7 દ્વાદશશિષ્યાન્
 આહૂય અમેધ્યભૂતાન્ વશીકર્તાં શક્તિં દત્વા તેષાં દ્વી દ્વી જનો પ્રેષિતવાન્ |
 8 પુનરિત્યાદિશદ્ યૂયમ્ એકૈકાં યષ્ટિં વિના વસ્ત્રસંપુટઃ પૂષ્પઃ કટિબન્ધે
 તામ્રખાડઞ્ચ ઓષાં કિમપિ મા ગ્રહ્ણીત, 9 માર્ગયાત્રાયૈ પાદેષૂપાનહૌ દત્વા દ્વે
 ઉત્તરીયે મા પરિધદ્વ્યં | 10 અપરમખ્યુક્તં તેન યૂયં યસ્યાં પુર્યાં યસ્ય
 નિવેશનં પ્રવેક્ષ્યથ તાં પુરીં યાવન્ન ત્યક્ષ્યથ તાવત્ તન્નિવેશને સ્થાસ્યથ | 11
 તત્ર યદિ કેપિ યુષ્માકમાતિથ્યં ન વિદધતિ યુષ્માકં કથાશ્ચ ન શૃણ્વન્તિ તર્હિ
 તત્સ્થાનાત્ પ્રસ્થાનસમયે તેષાં વિરુદ્ધં સાક્ષ્યં દાતું સ્વપાદાનાસ્કાલ્ય રજઃ
 સમ્પ્રાતયતઃ; અહં યુષ્માન્ યથાર્થં વચ્મિ વિચારદિને તન્નગરસ્થાવસ્થાતઃ
 સિદોમામોરયો નગરયોરવસ્થા સદ્યતરા ભવિષ્યતિ | 12 અથ તે ગત્વા
 લોકાનાં મનઃપરાવર્તનીઃ કથા પ્રચારિતવન્તઃ | 13 એવમનેકાન્ ભૂતાંશ્ચ
 ત્યાજિતવન્તસ્તથા તૈલેન મર્દયિત્વા બહૂન્ જનાનરોગાનકાર્ષુઃ | 14 ઇત્યં
 તસ્ય સુખ્યાતિશ્ચતુર્દિશો વ્યાપ્તા તદા હેરોદ્ રાજા તન્નિશમ્ય કથિતવાન્,
 યોહન્ મજ્જકઃ શ્મશાનાદ્ ઉત્થિત અતોહેતોસ્તેન સર્વા એતા અદ્ભુતક્રિયાઃ
 પ્રકાશન્તે | 15 અન્યેડકથયન્ અયમ્ એલિયઃ, કેપિ કથિતવન્ત એષ
 ભવિષ્યદ્વાદી યદ્વા ભવિષ્યદ્વાદિનાં સદૃશ એકોયમ્ | 16 કિન્તુ હેરોદ્
 ઇત્યાકાર્ણ્ય ભાષિતવાન્ યસ્યાહં શિરશ્ચિન્નવાન્ સ એવ યોહનયં સ
 શ્મશાનાદુદદિષ્ટત્ | 17 પૂર્વ્વં સ્વભ્રાતુઃ ક્ષિલિપસ્ય પત્ન્યા ઉદ્વાહં કૃતવન્તં
 હેરોદં યોહનવાદીત્ સ્વભ્રાતૃવધૂર્ન વિવાહ્યા | 18 અતઃ કારણાત્ હેરોદ્ લોકં
 પ્રહિત્ય યોહનં ધૃત્વા બન્ધનાલયે બદ્ધવાન્ | 19 હેરોદિયા તસ્મૈ યોહને પ્રકુપ્ય
 તં હન્તુમ્ ઐચ્છત્ કિન્તુ ન શક્તા, 20 યસ્માદ્ હેરોદ્ તં ધાર્મિકં સત્પુરુષઞ્ચ
 જ્ઞાત્વા સમ્મન્ય રક્ષિતવાન્; તત્કથાં શ્રુત્વા તદનુસારેણ બહૂનિ કર્મ્માણિ
 કૃતવાન્ હૃષ્ટમનાસ્તદ્દુપદેશં શ્રુતવાંશ્ચ | 21 કિન્તુ હેરોદ્ યદા સ્વજન્મદિને
 પ્રધાનલોકેભ્યઃ સેનાનીભ્યશ્ચ ગાલીલ્પ્રદેશીયશ્રેષ્ઠલોકેભ્યશ્ચ રાત્રૌ ભોજ્યમેકં
 કૃતવાન્ 22 તસ્મિન્ શુભદિને હેરોદિયાયાઃ કન્યા સમેત્ય તેષાં સમક્ષં સંનૃત્ય
 હેરોદસ્તેન સહોપવિષ્ટાનાઞ્ચ તોષમજ્જનત્ તતા નૃપઃ કન્યામાહ સ્મ મત્તો
 યદ્ યાયસે તદેવ તુભ્યં દાસ્યે | 23 શપથં કૃત્વાકથયત્ એદ્ રાજ્યાદ્ધમપિ

यायसे तदपि तुभ्यं दास्ये | 24 ततः सा बहिर्गत्वा स्वमातरं पप्रच्छ
 किमहं याचिष्ये? तदा साकथयत् योहनो भोजकस्य शिरः | 25 अथ तूर्णं
 भूपसभीपम् अेत्य यायमानावदत् क्षणोस्मिन् योहनो भोजकस्य शिरः
 पात्रे निधाय देहि, अेतद् यायेऽहं | 26 तस्मात् भूपोऽतिदुःखितः, तथापि
 स्वशपथस्य सडभोजिनाञ्चानुरोधात् तदनङ्गीकर्तुं न शक्तः | 27 तत्क्षणां
 राजा घातकं प्रेथ्य तस्य शिर आनेतुमादिष्टवान् | 28 ततः स कारागारं
 गत्वा तच्छिरश्छित्वा पात्रे निधायानीय तस्यै कन्यायै दत्तवान् कन्या य
 स्वमात्रे ददौ | 29 अनन्तरं योहनः शिष्यास्तद्वार्तां प्राप्यागत्य तस्य कुण्डपं
 श्मशानेऽस्थापयन् | 30 अथ प्रेषिता यीशोः सन्निधौ मिलिता यद् यय्
 यद्गुः शिक्षयामासुश्च तत्सर्व्ववार्तास्तस्मै कथितवन्तः | 31 स तानुवाय यूयं
 विजनस्थानं गत्वा विश्राम्यत यतस्तत्सन्निधौ बहुलोकानां समागमात् ते
 भोक्तुं नावकाशं प्राप्ताः | 32 ततस्ते नावा विजनस्थानं गुप्तं गग्मुः | 33
 ततो लोकनिवडस्तेषां स्थानान्तरयानं ददर्श, अनेके तं परिचित्य नानापुरेभ्यः
 पदैर्गजित्वा ज्वेन तेषामग्रे यीशोः समीपे उपतस्थुः | 34 तदा यीशुर्नावो
 बहिर्गत्य लोकारण्यानीं दृष्ट्वा तेषु करुणां कृतवान् यतस्तेऽरक्षकमेषा
 षवासन् तदा स तान् नानाप्रसङ्गान् उपदिष्टवान् | 35 अथ दिवान्ते सति
 शिष्या अेत्य यीशुमूयिरे, षडं विजनस्थानं दिनञ्चावसन्नं | 36 लोकानां
 किमपि षाधं नास्ति, अतश्चतुर्दिक्षु ग्रामान् गन्तुं भोज्यद्रव्याणि केतुञ्च
 भवान् तान् विसृजतु | 37 तदा स तानुवाय यूयमेव तान् भोजयत;
 ततस्ते जगद्गुर्वयं गत्वा द्विशतसंभ्यकैर्मुद्रापादैः पूषान् क्रीत्वा किं तान्
 भोजयिष्यामः? 38 तदा स तान् पृष्ठवान् युष्माकं सन्निधौ कति पूषा
 आसते? गत्वा पश्यत; ततस्ते दृष्ट्वा तमवदन् पञ्च पूषा द्वौ मत्स्यौ य
 सन्ति | 39 तदा स लोकान् शस्योपरि पंक्तिभिरुपवेशयितुम् आदिष्टवान्,
 40 ततस्ते शतं शतं जनाः पञ्चाशत् पञ्चाशज्जनाश्च पंक्तिभिर्भुवि
 समुपविशुः | 41 अथ स तान् पञ्चपूषान् मत्स्यद्वयञ्च धृत्वा स्वर्गं पश्यन्
 षश्वरगुणान् अन्वकीर्तयत् तान् पूषान् भंक्त्वा लोकेभ्यः परिवेषयितुं
 शिष्येभ्यो दत्तवान् द्वौ मत्स्यौ य विभज्य सर्व्वेभ्यो दत्तवान् | 42 ततः
 सर्व्वे भुक्त्वात्पृथन् | 43 अनन्तरं शिष्या अवशिष्टैः पूषैर्भत्स्यैश्च पूषान्
 द्दशऽल्लकान् जगूडुः | 44 ते भोक्तारः प्रायः पञ्च सड्भ्राणि पुरुषा

આસન્ | 45 અથ સ લોકાન્ વિસૃજન્નેવ નાવમારોહું સ્વસ્માદગ્રે પારે
 બૈત્સૈદાપુરં યાતુઞ્ચ શિષ્યન્ વાઢમાદિષ્ટવાન્ | 46 તદા સ સર્વાન્ વિસૃજ્ય
 પ્રાર્થયિતું પર્વતં ગતઃ | 47 તતઃ સન્ધ્યાયાં સત્યાં નૌઃ સિન્ધુમધ્ય ઉપસ્થિતા
 કિન્તુ સ એકાકી સ્થલે સ્થિતઃ | 48 અથ સમ્મુખવાતવહનાત્ શિષ્યા નાવં
 વાહયિત્વા પરિશ્રાન્તા ઇતિ જ્ઞાત્વા સ નિશાયતુર્થયામે સિન્ધૂપરિ પદ્ભ્યાં
 વ્રજન્ તેષાં સમીપમેત્ય તેષામગ્રે યાતુમ્ ઉદતઃ | 49 કિન્તુ શિષ્યાઃ સિન્ધૂપરિ
 તં વ્રજન્તં દૃષ્ટ્વા ભૂતમનુમાય રુરુવુઃ, 50 યતઃ સર્વે તં દૃષ્ટ્વા વ્યાકુલિતાઃ |
 અતએવ યીશુસ્તક્ષણાં તૈઃ સહાલપ્ય કથિતવાન્, સુસ્થિરા ભૂત, અયમહં
 મા ભૈષ્ટ | 51 અથ નૌકામારુહ્ય તસ્મિન્ તેષાં સન્નિધિં ગતે વાતો નિવૃત્તઃ;
 તસ્માત્તે મનઃસુ વિસ્મિતા આશ્ચર્ય્ય મેનિરે | 52 યતસ્તે મનસાં કાઠિન્યાત્
 તત્ પૂપીયમ્ આશ્ચર્ય્ય કર્મ્મ ન વિવિક્તવન્તઃ | 53 અથ તે પારં ગત્વા
 ગિનેષરત્રદેશમેત્ય તટ ઉપસ્થિતાઃ | 54 તેષુ નૌકાતો બહિર્ગતેષુ તત્રદેશીયા
 લોકાસ્તં પરિચિત્ય 55 ચતુર્દિક્ષુ ધાવન્તો યત્ર યત્ર રોગિણો નરા આસન્ તાન્
 સર્વાન્ ખટ્વોપરિ નિધાય યત્ર કુત્રચિત્ તદ્વાર્તાં પ્રાપુઃ તત્ સ્થાનમ્ આનેતુમ્
 આરેભિરે | 56 તથા યત્ર યત્ર ગ્રામે યત્ર યત્ર પુરે યત્ર યત્ર પલ્લ્યાઞ્ચ તેન
 પ્રવેશઃ કૃતસ્તદ્વર્ત્તમધ્યે લોકાઃ પીડિતાન્ સ્થાપયિત્વા તસ્ય ચેલગ્નિમાત્રં
 સ્પ્રષ્ટુમ્ તેષામર્થે તદનુજ્ઞાં પ્રાર્થયન્તઃ યાવન્તો લોકાઃ પસ્પૃશુસ્તાવન્ત એવ
 ગદાન્મુક્તાઃ |

7 અનન્તરં યિરૂશાલમ આગતાઃ દ્વિરૂશિનોડધ્યાપકાશ્ચ યીશોઃ સમીપમ્
 આગતાઃ | 2 તે તસ્ય કિયતઃ શિષ્યાન્ અશુચિકરૈરર્થાદ અપ્રક્ષાલિતહસ્તૈ
 ભુજ્જતો દૃષ્ટ્વા તાનદૂષયન્ | 3 યતઃ દ્વિરૂશિનઃ સર્વયિહૂદીયાશ્ચ પ્રાયાં
 પરમ્પરાગતવાક્યં સમ્મન્ય પ્રતલેન હસ્તાન્ અપ્રક્ષાલ્ય ન ભુજ્જતે |
 4 આપનાદાગત્ય મજ્જનં વિના ન ખાદન્તિ; તથા પાનપાત્રાણાં
 જલપાત્રાણાં પિત્તલપાત્રાણામ્ આસનાનાઞ્ચ જલે મજ્જનમ્ ઇત્યાદ્યોન્યેપિ
 બહવસ્તેષામાચારાઃ સન્તિ | 5 તે દ્વિરૂશિનોડધ્યાપકાશ્ચ યીશું પપ્રચ્છુઃ, તવ
 શિષ્યાઃ પ્રાયાં પરમ્પરાગતવાક્યાનુસારેણ નાયરન્તોડપ્રક્ષાલિતકરૈઃ કુતો
 ભુજ્જંતે? 6 તતઃ સ પ્રત્યુવાચ કપટિનો યુષ્માન્ ઉદ્દિશ્ય યિશયિયભવિષ્યદ્વાદી
 યુક્તમવાદીત્ | યથા સ્વકીયૈરધરૈરેતે સમ્મન્યનતે સદૈવ માં | કિન્તુ મત્તો
 વિપ્રકર્ષે સન્તિ તેષાં મનાંસિ ચ | 7 શિક્ષયન્તો બિધીન્ ન્નાજ્ઞા ભજન્તે માં

મુઘેવ તે | 8 યૂયં જલપાત્રપાનપાત્રાદીનિ મજજયન્તો મનુજપરમ્પરાગતવાક્યં
 રક્ષથ કિન્તુ ઈશ્વરાણાં લંઘધ્વે; અપરા ઈદૃશ્યોનેકાઃ ક્રિયા અપિ કુરુધ્વે | 9
 અન્યઞ્ચાકથયત્ યૂયં સ્વપરમ્પરાગતવાક્યસ્ય રક્ષાર્થં સ્પષ્ટરૂપેણ ઈશ્વરાણાં
 લોપયથ | 10 યતો મૂસાદ્ધારા પ્રોક્તમસ્તિ સ્વપિતરૌ સમ્મન્યધ્વં યસ્તુ
 માતરં પિતરં વા દુર્વાક્યં વક્તિ સ નિતાન્તં હન્યતાં | 11 કિન્તુ મદીયેન
 યેન દ્રવ્યેણ તવોપકારોભવત્ તત્ કર્મ્બાણમર્થાદ્ ઈશ્વરાય નિવેદિતમ્
 ઇદં વાક્યં યદિ કોપિ પિતરં માતરં વા વક્તિ 12 તર્હિ યૂયં માતુઃ પિતુ
 વોપકારં કર્તાં તં વારયથ | 13 ઇત્યં સ્વપ્રચારિતપરમ્પરાગતવાક્યેન યૂયમ્
 ઈશ્વરાણાં મુઘા વિઘદ્ધ્વે, ઈદૃશાન્યન્યાન્યનેકાનિ કર્મ્બાણિ કુરુધ્વે | 14
 અથ સ લોકાનાહૂય બભાષે યૂયં સર્વે મદ્વાક્યં શૃણુત બુધ્ધધ્વઞ્ચ | 15
 બાહ્યાદન્તરં પ્રવિશ્ય નરમમેધ્યં કર્તાં શકનોતિ ઈદૃશં કિમપિ વસ્તુ નાસ્તિ,
 વરમ્ અન્તરાદ્ બહિર્ગતં યદ્વસ્તુ તન્મનુજમ્ અમેધ્યં કરોતિ | 16 યસ્ય શ્રોતું
 શ્રોત્રે સ્તઃ સ શૃણોતુ | 17 તતઃ સ લોકાન્ હિત્વા ગૃહમધ્યં પ્રવિષ્ટસ્તદા
 શિષ્યાસ્તદૃષ્ટાન્તવાક્યાર્થં પપ્રચ્છુઃ | 18 તસ્માત્ સ તાન્ જગાદ યૂયમપિ
 કિમેતાદૃગબોધાઃ? કિમપિ દ્રવ્યં બાહ્યાદન્તરં પ્રવિશ્ય નરમમેધ્યં કર્તાં ન
 શકનોતિ કથામિમાં કિં ન બુધ્ધધ્વે? 19 તત્ તદન્તરં પ્રવિશતિ કિન્તુ
 કુક્ષિમધ્યં પ્રવિશતિ શેષે સર્વભુક્તવસ્તુગ્રાહિણિ બહિર્દેશે નિર્યાતિ | 20
 અપરમપ્યવાદીદ્ યન્નરાન્નિરેતિ તદેવ નરમમેધ્યં કરોતિ | 21 યતોડન્તરાદ્
 અર્થાન્ માનવાનાં મનોભ્યઃ કુચિન્તા પરસ્ત્રીવેશ્યાગમનં 22 નરવધશ્રૌર્યં
 લોભો દુષ્ટતા પ્રવચ્ચના કામુકતા કુદૃષ્ટિરીશ્વરનિન્દા ગર્વસ્તમ ઇત્યાદીનિ
 નિર્ગચ્છન્તિ | 23 એતાનિ સર્વાણિ દુરિતાન્યન્તરાદેત્ય નરમમેધ્યં કુર્વન્તિ |
 24 અથ સ ઉત્થાય તત્સ્થાનાત્ સોરસીદોન્પુરપ્રદેશં જગામ તત્ર કિમપિ
 નિવેશનં પ્રવિશ્ય સર્વૈરજ્ઞાતઃ સ્થાતું મતિઞ્ચક્રે કિન્તુ ગુપ્તઃ સ્થાતું ન શશાક |
 25 યતઃ સુરકૈનિકીદેશીયયૂનાનીવંશોદ્ભવસ્ત્રિયાઃ કન્યા ભૂતગ્રસ્તાસીત્ | સા
 સ્ત્રી તદ્ધાર્તાં પ્રાપ્ય તત્સમીપમાગત્ય તચ્ચરણયોઃ પતિત્વા 26 સ્વકન્યાતો
 ભૂતં નિરાકર્તાં તસ્મિન્ વિનયં કૃતવતી | 27 કિન્તુ યીશુસ્તામવદત્ પ્રથમં
 બાલકાસ્તૃપ્યન્તુ યતો બાલકાનાં ખાધં ગૃહીત્વા કુક્કુરેભ્યો નિક્ષેપોડનુચિતઃ |
 28 તદા સા સ્ત્રી તમવાદીત્ ભોઃ પ્રભો તત્ સત્યં તથાપિ મઞ્ચાધઃસ્થાઃ
 કુક્કુરા બાલાનાં કરપતિતાનિ ખાધખણ્ડાનિ ખાદન્તિ | 29 તતઃ સોડકથયદ્

अेतत्कथाडेतोः सकुशला याहि तव कन्यां त्यक्त्वा भूतो गतः | 30 अथ सा स्त्री गृहं गत्वा कन्यां भूतत्यक्तां शय्यास्थितां ददर्श | 31 पुनश्च स सोरसीदोन्पुरप्रदेशात् प्रस्थाय द्विकापलिदेशस्य प्रान्तरभागेन गालील्लजलधेः समीपं गतवान् | 32 तदा लोकेरेकं अधिरं कद्वदत्र नरं तन्निकटमानीय तस्य गात्रे हस्तमर्पयितुं विनयः कृतः | 33 ततो यीशु लोकारण्यात् तं निर्जनमानीय तस्य कर्णयोङ्गुली र्ददौ निष्ठीवं दत्त्वा य तज्जिह्वां पस्पर्श | 34 अनन्तरं स्वर्गं निरीक्ष्य दीर्घं निश्चस्य तमवदत् एतद्गतः अर्थान् मुक्तो भूयात् | 35 ततस्तत्क्षणां तस्य कर्णौ मुक्तौ जिह्वायाश्च जाड्यापगमात् स सुस्यष्टवाक्यमकथयत् | 36 अथ स तान् वाढमित्याद्विदेश यूयमिमां कथां कस्मैयिदपि मा कथयत, किन्तु स यति न्यषेधत् ते तति बाहुल्येन प्रायारयन्; 37 तेऽतियमत्कृत्य परस्परं कथयामासुः स अधिराय श्रवणशक्तिं मूकाय य कथनशक्तिं दत्त्वा सर्व्वं कर्म्मोत्तमरूपेण यकार |

8 तदा तत्समीपं बहवो लोका आयाता अतस्तेषां भोज्यद्रव्यात्मावाद् यीशुः शिष्यानाहूय जगाद्, | 2 लोकनिवडे मम कृपा जायते ते दिनत्रयं मया सार्द्धं सन्ति तेषां भोज्यं किमपि नास्ति | 3 तेषां मध्येऽनेके दूराद् आगताः, अभुक्तेषु तेषु मया स्वगृहमभिप्रहितेषु ते पथि क्लमिष्यन्ति | 4 शिष्या अवादिषुः, अेतावतो लोकान् तर्पयितुम् अत्र प्रन्तरे पूपान् प्राप्तुं केन शक्यते? 5 ततः स तान् पप्रच्छ युष्माकं कति पूपाः सन्ति? तेऽकथयन् सप्त | 6 ततः स तांल्लोकान् लुवि समुपवेष्टुम् आदिश्य तान् सप्त पूपान् धृत्वा एश्वरगुणान् अनुकीर्त्तयामास, लंक्त्वा परिवेषयितुं शिष्यान् प्रति ददौ, ततस्ते लोकेभ्यः परिवेषयामासुः | 7 तथा तेषां समीपे ये क्षुद्रमत्स्या आसन् तान्प्यादाय एश्वरगुणान् संकीर्त्य परिवेषयितुम् आदिष्टवान् | 8 ततो लोका लुक्त्वा तृप्तिं गता अवशिष्टाधैः पूर्णाः सप्तऽल्लका गृहीताश्च | 9 अेते भोक्तारः प्रायश्चतुः सल्लस्रपुरुषा आसन् ततः स तान् विससर्ज | 10 अथ स शिष्यः सल्ल नावमारुह्य दल्मानूथासीमामागतः | 11 ततः परं क्रिश्चिन आगत्य तेन सल्ल विवदमानास्तस्य परीक्षार्थम् आकाशीयचिह्नं द्रष्टुं यायितवन्तः | 12 तदा सोऽन्तर्दीर्घं निश्चस्याकथयत्, अेते विधमाननराः कुतश्चिन्धं भृगयन्ते? युष्मानलं यथार्थं ब्रवीमि लोकानेतान् किमपि चिह्नं न दर्शयिष्यते | 13 अथ तान् ङित्वा पुनर्नावम् आरुह्य पारमगात् | 14 अेतर्दि

શિષ્યૈઃ પૂપેષુ વિસ્મૃતેષુ નાવિ તેષાં સન્નિઘૌ પૂપ એકએવ સ્થિતઃ | 15 તદાનીં
 યીશુસ્તાન્ આદિષ્ટવાન્ ફિરુશિનાં હેરોદશ્ચ કિલ્વં પ્રતિ સતર્કાઃ સાવધાનાશ્ચ
 ભવત | 16 તતસ્તેડન્યોન્યં વિવેચનં કર્તુમ્ આરેભિરે, અસ્માકં સન્નિઘૌ
 પૂપો નાસ્તીતિ હેતોરિદં કથયતિ | 17 તદ્ બુદ્ધ્વા યીશુસ્તેભ્યોડકથયત્
 યુષ્માકં સ્થાને પૂપાભાવાત્ ક્રુત ઇત્યં વિતર્કયથ? યૂયં કિમધાપિ કિમપિ
 ન જાનીથ? બોદ્ધુઞ્ચ ન શક્નુથ? યાવદ્ધ કિં યુષ્માકં મનાંસિ કઠિનાનિ
 સન્તિ? 18 સત્સુ નેત્રેષુ કિં ન પશ્યથ? સત્સુ કર્ણેષુ કિં ન શૃણુથ? ન
 સ્મરથ ચ? 19 યદાહં પઞ્ચપૂપાન્ પઞ્ચસહસ્રાણાં પુરુષાણાં મધ્યે ભંકત્વા
 દત્તવાન્ તદાનીં યૂયમ્ અવશિષ્ટપૂપૈઃ પૂર્ણાન્ કતિ ડલ્લકાન્ ગૃહીતવન્તઃ?
 તેડકથયન્ દ્વાદશડલ્લકાન્ | 20 અપરઞ્ચ યદા ચતુઃસહસ્રાણાં પુરુષાણાં
 મધ્યે પૂપાન્ ભંકત્વાદદાં તદા યૂયમ્ અતિરિક્તપૂપાનાં કતિ ડલ્લકાન્
 ગૃહીતવન્તઃ? તે કથયામાસુઃ સપ્તડલ્લકાન્ | 21 તદા સ કથિતવાન્ તર્હિ
 યૂયમ્ અધુનાપિ ક્રુતો બોદ્ધુન્ ન શક્નુથ? 22 અનન્તરં તસ્મિન્ બૈત્સૈદાનગરે
 પ્રાપ્તે લોકા અન્ધમેકં નરં તત્સમીપમાનીય તં સ્પ્રષ્ટું તં પ્રાર્થયાઞ્ચક્રિરે |
 23 તદા તસ્યાન્ધસ્ય કરૌ ગૃહીત્વા નગરાદ્ બહિર્દેશં તં નીતવાન્; તન્નેત્રે
 નિષ્ઠીવં દત્વા તદ્ગત્રે હસ્તાવર્પયિત્વા તં પપ્રચ્છ, કિમપિ પશ્યસિ? 24 સ
 નેત્રે ઉન્મીલ્ય જગાદ, વૃક્ષવત્ મનુજાન્ ગચ્છતો નિરીક્ષે | 25 તતો યીશુઃ
 પુનસ્તસ્ય નયનયો હસ્તાવર્પયિત્વા તસ્ય નેત્રે ઉન્મીલયામાસ; તસ્માત્
 સ સ્વસ્થો ભૂત્વા સ્પષ્ટરૂપં સર્વ્વલોકાન્ દદર્શ | 26 તતઃ પરં ત્વં ગ્રામં મા
 ગચ્છ ગ્રામસ્થં કમપિ ચ કિમપ્યનુક્રત્વા નિજગૃહં યાહીત્યાદિશ્ય યીશુસ્તં
 નિજગૃહં પ્રહિતવાન્ | 27 અનન્તરં શિષ્યૈઃ સહિતો યીશુઃ કૈસરીયાફિલિપિપુરં
 જગામ, પથિ ગચ્છન્ તાનપૃચ્છત્ કોડહમ્ અત્ર લોકાઃ કિં વદન્તિ? 28
 તે પ્રત્યૂચુઃ ત્વાં યોહનં મજ્જકં વદન્તિ કિન્તુ કેપિ કેપિ ઓલિયં વદન્તિ;
 અપરે કેપિ કેપિ ભવિષ્યદ્વાદિનામ્ એકો જન ઇતિ વદન્તિ | 29 અથ સ
 તાનપૃચ્છત્ કિન્તુ કોહમ્? ઇત્યત્ર યૂયં કિં વદથ? તદા પિતરઃ પ્રત્યવદત્
 ભવાન્ અભિષિક્તસ્ત્રાતા | 30 તતઃ સ તાન્ ગાઢમાદિશદ્ યૂયં મમ કથા
 ક્સમૈથિદપિ મા કથયત | 31 મનુષ્યપુત્રેણાવશ્યં બહવો યાતના ભોક્તવ્યાઃ
 પ્રાચીનલોકૈઃ પ્રધાનયાજકૈરધ્યાપકૈશ્ચ સ નિન્દિતઃ સન્ ઘાતયિષ્યતે તૃતીયદિને
 ઉત્થાસ્યતિ ચ, યીશુઃ શિષ્યાનુપદેષ્ટુમારભ્ય કથામિમાં સ્પષ્ટમાચષ્ટ | 32

तस्मात् पितरस्तस्य हस्तौ धृत्वा तं तर्जितवान्। 33 किन्तु स मुष्णं
 परावर्त्य शिष्यगणं निरीक्ष्य पितरं तर्जयित्वावादीद् दूरीभव विघ्नकारिन्
 ईश्वरीयकार्यैर्दपि मनुष्यकार्यं तुभ्यं रोयततरां। 34 अथ स लोकान्
 शिष्यांश्चाहूय जगाद् यः कश्चिन् मामनुगन्तुम् ईच्छति स आत्मानं
 दाभ्यतु, स्वकुशं गृहीत्वा मत्पश्चाद् आयातु। 35 यतो यः कश्चित् स्वप्राणं
 रक्षितुमिच्छति स तं हारयिष्यति, किन्तु यः कश्चिन् मर्त्यं सुसंवाद्यार्थञ्च
 प्राणं हारयति स तं रक्षिष्यति। 36 अपरञ्च मनुजः सर्व्वं जगत् प्राप्य यदि
 स्वप्राणं हारयति तर्हि तस्य को लाभः? 37 नरः स्वप्राणविनिमयेन किं दातुं
 शक्नोति? 38 अत्रेषां व्यभियारिणां पापिनाञ्च लोकानां साक्षाद् यदि कोपि
 मां मत्तथाञ्च लज्जास्पदं जानाति तर्हि मनुजपुत्रो यदा धर्मदूतैः सङ्घ पितुः
 प्रभावेणागमिष्यति तदा सोपि तं लज्जास्पदं ज्ञास्यति।

9 अथ स तानवादीत् युष्मत्समं यथार्थं कथयामि, ईश्वरराज्यं
 पराक्रमेणोपस्थितं न दृष्ट्वा मृत्युं नास्वाद्विष्यन्ते, अत्र दास्यमानानां
 मध्येपि तादृशा लोकाः सन्ति। 2 अथ षड्दिनेभ्यः परं यीशुः पितरं याकूबं
 योडनञ्च गृहीत्वा गिरेरुच्यस्य निर्जनस्थानं गत्वा तेषां प्रत्यक्षे मूर्त्यन्तरं
 दधार। 3 ततस्तस्य परिधेयम् ईदृशम् उज्ज्वललडिमपाण्डरं जातं यद्
 जगति कोपि रजको न तादृक् पाण्डरं कर्त्ता शक्नोति। 4 अपरञ्च अेलियो
 भूसाञ्च तेभ्यो दर्शनं दत्त्वा यीशुना सङ्घ कथनं कर्त्तुमारंभाते। 5 तदा पितरो
 यीशुमवादीत् हे गुरोऽस्माकमत्र स्थितिरुत्तमा, ततश्चेव वयं त्वत्कृते अेकां
 भूसाकृते अेकाम् अेलियकृते यैकां, अेतास्तिस्त्रः कुटी निर्भामि। 6 किन्तु
 स यद्गुक्तवान् तत् स्वयं न बुबुधे ततः सर्व्वे विभयाञ्चक्रुः। 7 अेतर्हि
 पयोदस्तान् छाद्यामास, ममयां प्रियः पुत्रः कथासु तस्य मनांसि निवेशयतेति
 नभोवाणी तन्मेधान्निर्ययौ। 8 अथ हठात्ते यतुर्दिशो दृष्ट्वा यीशुं विना स्वैः
 सङ्घितं कमपि न दृशुः। 9 ततः परं गिरेरवरोहणकाले स तान् गाढम्
 दूत्यादिदेश यावन्नरसूनोः श्मशानाद्गुत्थानं न भवति, तावत् दर्शनस्यास्य
 वार्त्ता युष्माभिः कस्मैयिदपि न वक्तव्या। 10 तदा श्मशानाद्गुत्थानस्य
 कोभिप्राय एति विचार्य्य ते तद्वाक्यं स्वेषु गोपायाञ्चक्रिरे। 11 अथ ते यीशुं
 पप्रच्छुः प्रथमत अेलियेनागन्तव्यम् एति वाक्यं कुत उपाध्याया आहुः? 12
 तदा स प्रत्युवाच, अेलियः प्रथममेत्य सर्व्वकार्याणि साधयिष्यति; नरपुत्रे

य लिपि र्यथास्ते तथैव सोपि बहुदुःखं प्राप्यावज्ञास्यते | 13 किन्त्वहं
 युष्मान् वदामि, अेलियार्थे लिपि र्यथास्ते तथैव स अेत्य ययौ, लोकाः
 स्वेष्वानुसुपं तमभिव्यवदरन्ति स्म | 14 अनन्तरं स शिष्यसमीपमेत्य
 तेषां यतुःपार्श्वे तैः सह बहुजनान् विवदमानान् अध्यापकांश्च दृष्टवान्; 15
 किन्तु सर्व्वलोकस्तं दृष्ट्वैव यमत्कृत्य तदासन्नं धावन्तस्तं प्रणोमुः | 16
 तदा यीशुरध्यापकानप्राक्षीद् अेतैः सह यूयं किं विवदध्वे? 17 ततो लोकानां
 कश्चिद्रेकः प्रत्यवादीत् हे गुरो मम सूनुं मूकं भूतधृतञ्च भवदासन्नम् आनयं |
 18 यदासौ भूतस्तमाकमते तदैव पातसति तथा स झेणायते, एन्तैर्दन्तान्
 धर्षति क्षीणो भवति यः ततो हेतोस्तं भूतं त्याजयितुं भवच्छिष्यान्
 निवेदितवान् किन्तु ते न शेडुः | 19 तदा स तमवादीत्, रे अविश्वासिनः
 सन्ताना युष्माभिः सह कति कालानहं स्थास्यामि? अपरान् कति कालान्
 वा व आयारान् सदिष्ये? तं मदासन्नमानयत | 20 ततस्तत्सन्निधिं स
 आनीयत किन्तु तं दृष्ट्वैव भूतो बालकं धृतवान्; स य भूमौ पतित्वा
 झेणायमानो लुलोठ | 21 तदा स तत्पितरं पप्रच्छ, अस्येदृशी दशा कति
 दिनानि भूता? ततः सोवादीत् बाल्यकालात् | 22 भूतोयं तं नाशयितुं
 बहुवारान् वह्नौ जले य न्यक्षिपत् किन्तु यद्वि भवान किमपि कर्त्ता शक्नोति
 तर्हि दयां कृत्वास्मान् उपकरोतु | 23 तदा यीशुस्तमवदत् यद्वि प्रत्येतुं
 शक्नोषि तर्हि प्रत्ययिने जनाय सर्व्व साध्यम् | 24 ततस्तत्क्षणां तद्बालकस्य
 पिता प्रोच्यै इवन् साश्रुनेत्रः प्रोवाय, प्रभो प्रत्येमि ममाप्रत्ययं प्रतिकुरु | 25
 अथ यीशु लोकासङ्घं धावित्वायान्तं दृष्ट्वा तमपूतभूतं तर्जयित्वा जगाद्,
 रे अधिर मूक भूत त्वमेतस्माद् बहिर्भव पुनः कदापि माश्रयैनं त्वामहम्
 एत्यादिशामि | 26 तदा स भूतश्चीत्साब्दं कृत्वा तमापीडय बहिर्ज्जाम,
 ततो बालको मृतकल्पो बभूव तस्मादयं मृतगत्यनेके कथयामासुः | 27
 किन्तु करं धृत्वा यीशुनोत्थापितः स उत्तस्थौ | 28 अथ यीशौ गृहं प्रविष्टे
 शिष्या गुप्तं तं पप्रच्छ; वयमेनं भूतं त्याजयितुं कुतो न शक्ताः? 29 स
 उवाच, प्रार्थनोपवासौ विना केनाप्यन्येन कर्म्मणा भूतमीदृशं त्याजयितुं न
 शक्यं | 30 अनन्तरं स तत्स्थानादित्वा गालीलमध्येन ययौ, किन्तु तत् कोपि
 जनीयादिति स नैच्छत् | 31 अपरञ्च स शिष्यानुपदिशन् बभाषे, नरपुत्रो
 नरहस्तेषु समर्पयिष्यते ते य तं हनिष्यन्ति तैस्तस्मिन् हते तृतीयदिने स

उत्थास्यतीति | 32 किन्तु तत्कथां ते नाबुध्यन्त प्रष्टुञ्च बिल्यः | 33 अथ
 यीशुः कङ्कनाङ्गुमुरमागत्य मध्येगृह्यत्येते तानपृच्छद् वर्त्ममध्ये यूयमन्योन्यं
 किं विवदध्वे स्म? 34 किन्तु ते निरुत्तरास्तस्थु र्यस्मात्तेषां को भुञ्ज्येति
 वर्त्मानि तेऽन्योन्यं व्यवदन्त | 35 ततः स उपविश्य द्वादशशिष्यान् आहूय
 बलाषे यः कश्चित् भुञ्ज्यो भवितुमिच्छति स सर्व्वेभ्यो गौणः सर्व्वेषां
 सेवकश्च भवतु | 36 तदा स बालकमेकं गृहीत्वा मध्ये समुपावेशयत् ततस्तं
 कोडे कृत्वा तानवादात् 37 यः कश्चिद्दीदृशस्य कस्यापि बालस्यातिथ्यं करोति
 स भमातिथ्यं करोति; यः कश्चिन्भमातिथ्यं करोति स केवलम् भमातिथ्यं
 करोति तन्न भत्प्रेरकस्याप्यातिथ्यं करोति | 38 अथ योऽन् तमब्रवीत्
 हे गुरो, अस्माकमननुगामिनम् अेकं त्वान्नाम्ना भूतान् त्याजयन्तं वयं
 दृष्टवन्तः, अस्माकमपश्चाद्गामित्वाय्य तं न्यषेधाम | 39 किन्तु यीशुरवदत् तं
 मा निषेधतु, यतो यः कश्चिन् मन्नाम्ना यित्रं कर्म करोति स सडसा मां
 निन्दितुं न शक्नोति | 40 तथा यः कश्चिद् युष्माकं विपक्षतां न करोति स
 युष्माकमेव सपक्षः | 41 यः कश्चिद् युष्मान् प्रीष्टशिष्यान् ज्ञात्वा मन्नाम्ना
 कंसैकेन पानीयं पातुं ददाति, युष्मानहं यथार्थं वय्मि, स इलेन वञ्चितो न
 भविष्यति | 42 किन्तु यदि कश्चिन् मयि विश्वासिनामेषां क्षुद्रप्राणिनाम्
 अेकस्यापि विध्नं जनयति, तर्हि तस्यैतत्कर्म करणात् कण्ठबद्धपेषणीकस्य
 तस्य सागरगाधजल मञ्जजनं भद्रं | 43 अतः स्वकरो यदि त्वां बाधते तर्हि
 तं छिन्धि; 44 यस्मात् यत्र कीटा न भ्रियन्ते वह्निश्च न निर्व्वीति, तस्मिन्
 अनिर्व्वीणानलनरके करद्वयवस्तव गमनात् करडीनस्य स्वर्गप्रवेशस्तव
 क्षेमं | (Geenna g1067) 45 यदि तव पादो विध्नं जनयति तर्हि तं छिन्धि, 46
 यतो यत्र कीटा न भ्रियन्ते वह्निश्च न निर्व्वीति, तस्मिन् ऽनिर्व्वीणवह्नौ
 नरके द्विपादवस्तव निक्षेपात् पादडीनस्य स्वर्गप्रवेशस्तव क्षेमं | (Geenna
 g1067) 47 स्वनेत्रं यदि त्वां बाधते तर्हि तदप्युत्पाटय, यतो यत्र कीटा न
 भ्रियन्ते वह्निश्च न निर्व्वीति, 48 तस्मिन् ऽनिर्व्वीणवह्नौ नरके द्विनेत्रस्य तव
 निक्षेपाद् अेकनेत्रवत ईश्वरराज्ये प्रवेशस्तव क्षेमं | (Geenna g1067) 49
 यथा सर्व्वो बलि लवणाक्तः क्रियते तथा सर्व्वो जनो वह्निःपेषण लवणाक्तः
 कारिष्यते | 50 लवणं भद्रं किन्तु यदि लवणो स्वाद्गुता न तिष्ठति, तर्हि कथम्
 आस्वाधुक्तं करिष्यथ? यूयं लवणयुक्ता भवत परस्परं प्रेम कुरुत |

10 अनन्तरं स तत्स्थानात् प्रस्थाय यद्दननधाः पारे यिडूदाप्रदेश
 उपस्थितवान्, तत्र तदन्तिके लोकानां समागमे जाते स निजरीत्यनुसारेण
 पुनस्तान् उपदिदेश। 2 तदा डिउशिनस्तत्समीपम् अत्य तं परीक्षितुं
 पप्रच्छः स्वजाया मनुजानां त्यज्या न वेति? 3 ततः स प्रत्यवादीत्,
 अत्र कार्यं मूसा युष्मान् प्रति किमाज्ञापयत्? 4 त उायुः त्यागपत्रं
 लेभितुं स्वपत्नीं त्यक्तुञ्च मूसाऽनुमन्यते। 5 तदा यीशुः प्रत्युवाय,
 युष्माकं मनसां काठिन्याद्धेतो मूसा निदेशमिमम् अलिपत्। 6 किन्तु
 सृष्टेरादौ एश्वरो नरान् पुंउपेण स्त्रीउपेण च ससर्ज। 7 "ततः कारणात्
 पुमान् पितरं मातरञ्च त्यक्त्वा स्वजायायाम् आसक्तो भविष्यति, 8
 तौ द्वाव् अेकाङ्गौ भविष्यतः। " तस्मात् तत्कालमारभ्य तौ न द्वाव्
 अेकाङ्गौ। 9 अतः कारणाद् एश्वरो यद्योजयत् कोपि नरस्तन्न वियेजयेत्।
 10 अथ यीशु गृहं प्रविष्टस्तदा शिष्याः पुनस्तत्कथां तं पप्रच्छुः। 11
 ततः सोवदत् कश्चिद् यदि स्वभार्यां त्यक्तवान्याम् उद्वडति तर्हि स
 स्वभार्यायाः प्रातिकूल्येन व्यभियारी भवति। 12 कायिन्नारी यदि
 स्वपतिं हित्वान्यपुंसा विवाहिता भवति तर्हि सापि व्यभियारिणी
 भवति। 13 अथ स यथा शिशून् स्पृशेत्, तदर्थं लोकेस्तदन्तिकं शिशव
 आनीयन्त, किन्तु शिष्यास्तानानीतवतस्तर्ज्यामासुः। 14 यीशुस्तद् दृष्ट्वा
 कुध्यन् जगाद, मन्किटम् आगन्तुं शिशून् मा वारयत, यत अेतादृशा
 एश्वरराज्याधिकारिणः। 15 युष्मानहं यथार्थं वस्मि, यः कश्चित् शिशुवद्
 भूत्वा राज्यमीश्वरस्य न गृह्णीयात् स कदापि तद्राज्यं प्रवेष्टुं न शक्नोति।
 16 अनन्तरं स शिशून्क्रे निधाय तेषां गात्रेषु उस्तौ हत्वाशिषं बभाषे। 17
 अथ स वर्त्मना याति, अेतर्हि जन अेको धावन् आगत्य तत्सम्मुषे जानुनी
 पातयित्वा पृष्टवान्, भोः परमगुरो, अनन्तायुः प्राप्तये मया किं कर्तव्यं?
 (aiōnios g166) 18 तदा यीशुरुवाच, मां परमं कुतो वदसि? विनेश्वरं कोपि
 परमो न भवति। 19 परस्त्रीं नाभिगच्छ; नरं मा घातय; स्तेयं मा कुरु;
 मृषासाक्ष्यं मा देहि; हिंसाञ्च मा कुरु; पितरौ सम्मन्यस्व; निदेशा अेते
 त्वया ज्ञाताः। 20 ततस्तन्न प्रत्युक्तं, हे गुरो बाल्यकालादहं सर्वानितान्
 आचरामि। 21 तदा यीशुस्तं विलोक्य स्नेहेन बभाषे, तवैकस्याभाव
 आस्ते; त्वं गत्वा सर्वस्वं विक्रीय दरिद्रेभ्यो विश्राणाय, ततः स्वर्गं धनं

प्राप्स्यसि; ततः परम् अेत्य कुशं वडन् मडनुवर्ती भव | 22 किन्तु तस्य
 बहुसम्पद्धिमानत्वात् स एमां कथामाकार्य विषयो दुःषितश्च सन्
 जगाम | 23 अथ यीशुश्चतुर्दिशो निरीक्ष्य शिष्यान् अवादीत्, धनिलोकानाम्
 ईश्वरराज्यप्रवेशः कीदृग् दुष्करः | 24 तस्य कथातः शिष्याश्चमय्यङ्कुः, किन्तु
 स पुनरवदत्, हे बालका ये धने विश्वसन्ति तेषाम् ईश्वरराज्यप्रवेशः
 कीदृग् दुष्करः | 25 ईश्वरराज्ये धनिनां प्रवेशात् सूयिरन्ध्रेण मडाङ्गस्य
 गमनागमनं सुकरं | 26 तदा शिष्या अतीव विस्मिताः परस्परं प्रोयुः, तर्हि
 कः परित्राणं प्राप्नुं शक्नोति? 27 ततो यीशुस्तान् विलोक्य बलाधे, तन्
 नरस्यासाध्यं किन्तु नेश्वरस्य, यतो हेतोरीश्वरस्य सर्व्व साध्यम् | 28
 तदा पितर उवाच, पश्य वयं सर्व्वं परित्यज्य भवतोनुगामिनो जाताः |
 29 ततो यीशुः प्रत्यवदत्, युष्मानहं यथार्थं वदामि, महर्थं सुसंवाद्यार्थं वा
 यो जनः सदनं भ्रातरं भगिनीं पितरं मातरं जायां सन्तानान् भूमि वा
 त्यक्त्वा 30 गृहभ्रातृभगिनीपितृमातृपत्नीसन्तानभूमिनामिह शतगुणान्
 प्रेत्यानन्तायुश्च न प्राप्नोति तादृशः कोपि नास्ति | (aiōn g165, aiōnios g166)
 31 किन्त्वग्रीया अनेके लोकाः शेषाः, शेषीया अनेके लोकाश्चात्रा भविष्यन्ति |
 32 अथ यिज्ञासालभ्यानकाले यीशुस्तेषाम् अग्रगामी भूत्वा, तस्मात्ते यित्रं
 ज्ञात्वा पश्चाद्गामिनो भूत्वा भिष्युः | तदा स पुन द्वादशशिष्यान् गृहीत्वा
 स्वीयं यद्यद् घटिष्यते तत्तत् तेभ्यः कथयितुं प्रारभे; 33 पश्यत वयं
 यिज्ञासालभ्युरं यामः, तत्र मनुष्यपुत्रः प्रधानयाजकानाम् उपाध्यायानाञ्च
 करेषु समर्पयिष्यते; ते य वधदण्डाज्ञां दापयित्वा परदेशीयानां करेषु तं
 समर्पयिष्यन्ति | 34 ते तमुपलस्य कशया प्रहृत्य तद्वपुषि निष्ठीवं निक्षिप्य
 तं हनिष्यन्ति, ततः स तृतीयदिने प्रोत्थास्यति | 35 ततः सिसवदेः पुत्रौ
 यादूष्योहनौ तदन्तिकम् अेत्य प्रोयतुः, हे गुरो यद् आवाभ्यां यायिष्यते
 तदस्मदर्थं भवान् करोतु निवेदनमिदमावयोः | 36 ततः स कथितवान्, युवां
 किमिच्छथः? किं मया युष्मदर्थं करणीयं? 37 तदा तौ प्रोयतुः, आवयोरेकं
 दक्षिणपार्श्वे वामपार्श्वे यैकं तवैश्वर्य्यपदे समुपवेष्टुम् आज्ञापय | 38 किन्तु
 यीशुः प्रत्युवाच युवामज्ञात्वेहं प्रार्थयेथे, येन कंसेनाहं पास्यामि तेन युवाभ्यां
 किं पातुं शक्यते? यस्मिन् मञ्जनेनाहं मञ्जिष्ये तन्मञ्जने मञ्जयितुं किं
 युवाभ्यां शक्यते? तौ प्रत्युयतुः शक्यते | 39 तदा यीशुरवदत् येन कंसेनाहं

પાસ્યામિ તેનાવશ્યં યુવામપિ પાસ્યથઃ, યેન મજ્જનેન યાહં મજ્જિજ્યે તત્ર યુવામપિ મજ્જિજ્યેથે | 40 કિન્તુ યેષામર્થમ્ ઇદં નિરૂપિતં, તાન્ વિહાયાન્યં કમપિ મમ દક્ષિણપાર્શ્વે વામપાર્શ્વે વા સમુપવેશયિતું મમાધિકારો નાસ્તિ | 41 અથાન્યદશશિષ્યા ઇમાં કથાં શ્રુત્વા યાકૂબ્યોહન્ત્યાં યુકુપુઃ | 42 કિન્તુ યીશુસ્તાન્ સમાહૂય બભાષે, અન્યદેશીયાનાં રાજત્વં યે કુર્વન્તિ તે તેષામેવ પ્રભુત્વં કુર્વન્તિ, તથા યે મહાલોકાસ્તે તેષામ્ અધિપતિત્વં કુર્વન્તીતિ યૂયં જાનીથ | 43 કિન્તુ યુષ્માકં મધ્યે ન તથા ભવિષ્યતિ, યુષ્માકં મધ્યે યઃ પ્રાધાન્યં વાચ્છતિ સ યુષ્માકં સેવકો ભવિષ્યતિ, 44 યુષ્માકં યો મહાન્ ભવિતુમિચ્છતિ સ સર્વેષાં કિકુરો ભવિષ્યતિ | 45 યતો મનુષ્યપુત્રઃ સેવ્યો ભવિતું નાગતઃ સેવાં કર્તા તથાનેકેષાં પરિત્રાણસ્ય મૂલ્યરૂપસ્વપ્રાણં દાતુઞ્ચાગતઃ | 46 અથ તે યિરીહોનગરં પ્રાપ્તાસ્તસ્માત્ શિષ્યૈ લોકેશ્ચ સહ યીશો ગર્મનકાલે ટીમયસ્ય પુત્રો બર્ટીમયનામા અન્ધસ્તન્માર્ગપાર્શ્વે ભિક્ષાર્થમ્ ઉપવિષ્ટઃ | 47 સ નાસરતીયસ્ય યીશોરાગમનવાર્તા પ્રાપ્ય પ્રોથૈ વર્ક્તુમારેભે, હે યીશો દાયૂદઃ સન્તાન માં દયસ્વ | 48 તતોનેકે લોકા મૌનીભવેતિ તં તર્જયામાસુઃ, કિન્તુ સ પુનરધિકમુચ્યૈ જંગાદ, હે યીશો દાયૂદઃ સન્તાન માં દયસ્વ | 49 તદા યીશુઃ સ્થિત્વા તમાહ્વાતું સમાદિદેશ, તતો લોકાસ્તમન્ધમાહૂય બભાષિરે, હે નર, સ્થિરો ભવ, ઉત્તિષ્ઠ, સ ત્વામાહ્વયતિ | 50 તદા સ ઉત્તરીયવસ્ત્રં નિક્ષિપ્ય પ્રોત્થાય યીશોઃ સમીપં ગતઃ | 51 તતો યીશુસ્તમવદત્ ત્વયા કિં પ્રાર્થ્યતે? તુભ્યમહં કિં કરિષ્યામી? તદા સોન્ધસ્તમુવાચ, હે ગુરો મદીયા દૃષ્ટિર્ભવેત્ | 52 તતો યીશુસ્તમુવાચ યાહિ તવ વિશ્વાસસ્ત્વાં સ્વસ્થમકાર્ષીત્, તસ્માત્ તત્ક્ષણં સ દૃષ્ટિં પ્રાપ્ય પથા યીશોઃ પશ્ચાદ્ યયૌ |

11 અનન્તરં તેષુ ચિરૂશાલમઃ સમીપસ્થયો વૈત્કુગીબૈથનીયપુરયોરન્તિકરશ્ચં જૈતુનનામાદ્વિમાગતેષુ યીશુઃ પ્રેષણકાલે દ્વૌ શિષ્યાવિદં વાક્યં જગાદ, 2 યુવામમું સમ્મુખસ્થં ગ્રામં યાતં, તત્ર પ્રવિશ્ય યો નરં નાવહત્ તં ગર્દભશાવકં દ્રક્ષ્યથસ્તં મોચયિત્વાનયતં | 3 કિન્તુ યુવાં કર્મ્મેદં કુતઃ કુરુથઃ? કથામિમાં યદિ કોપિ પૃચ્છતિ તર્હિ પ્રભોરત્ર પ્રયોજનમસ્તીતિ કથિતે સ શીઘ્રં તમત્ર પ્રેષયિષ્યતિ | 4 તતસ્તૌ ગત્વા દ્વિમાર્ગમેલને કસ્યચિદ્ દ્વારસ્ય પાર્શ્વે તં ગર્દભશાવકં પ્રાપ્ય મોચયતઃ, 5 એતર્હિ તત્રોપસ્થિતલોકાનાં કશ્ચિદ્ અપૃચ્છત્,

ગર્દભશિશું કુતો મોચયથઃ? 6 તદા યીશોરાજ્ઞાનુસારેણ તેભ્યઃ પ્રત્યુદિતે
 તત્ક્ષણં તમાદાતું તેડનુજ્ઞુઃ | 7 અથ તૌ યીશોઃ સન્નિધિં ગર્દભશિશુમ્
 આનીય તદ્દુપરિ સ્વવસ્ત્રાણિ પાતયામાસતુઃ; તતઃ સ તદ્દુપરિ સમુપવિષ્ટઃ |
 8 તદાનેકે પથિ સ્વવાસાંસિ પાતયામાસુઃ, પરૈશ્ચ તરુશાખાશ્છિતવા માર્ગે
 વિકીર્ણાઃ | 9 અપરઞ્ચ પશ્ચાદ્રામિનોડગ્રગામિનશ્ચ સર્વે જના ઉચૈઃસ્વરેણ
 વક્તુમારેભિરે, જય જય યઃ પરમેશ્વરસ્ય નામ્નાગચ્છતિ સ ધન્ય ઇતિ |
 10 તથાસ્માકમં પૂર્વપુરુષસ્ય દાયુદો યદ્રાજ્યં પરમેશ્વરનામ્નાયાતિ તદપિ
 ધન્યં, સર્વસ્માદુચ્છ્રાયે સ્વર્ગે ઇશ્વરસ્ય જયો ભવેત્ | 11 ઇત્યં યીશુ
 યિરૂશાલમિ મન્દિરં પ્રવિશ્ય ચતુર્દિક્સ્થાનિ સર્વાણિ વસ્તૂનિ દૃષ્ટવાનઃ; અથ
 સાયંકાલ ઉપસ્થિતે દ્વાદશશિષ્યસહિતો ભૈથનિયં જગામ | 12 અપરેહનિ
 ભૈથનિયાદ્ આગમનસમયે ક્ષુધાર્તો બભૂવ | 13 તતો દૂરે સપત્રમુડુમ્બરપાદપં
 વિલોક્ય તત્ર કિચ્ચિત્ ફલં પ્રાપ્તું તસ્ય સન્નિકૃષ્ટં યયૌ, તદાનીં ફલપાતનસ્ય
 સમયો નાગચ્છતિ | તતસ્તત્રોપસ્થિતઃ પત્રાણિ વિના કિમપ્યપરં ન પ્રાપ્ય સ
 કથિતવાનઃ, 14 અધારભ્ય કોપિ માનવસ્ત્વત્તઃ ફલં ન ભુઞ્જીતઃ; ઇમાં કથાં
 તસ્ય શિષ્યાઃ શુશ્રુવુઃ | (aiṅg g165) 15 તદનન્તરં તેષુ યિરૂશાલમમાયાતેષુ
 યીશુ મન્દિરં ગત્વા તત્રસ્થાનાં બણિજાં મુદ્રાસનાનિ પારાવતવિક્રેતૃણામ્
 આસનાનિ ચ ન્યુબ્જયાઞ્ચકાર સર્વાન્ ક્રેતૃન્ વિક્રેતૃશ્ચ બહિશ્ચકાર | 16
 અપરં મન્દિરમધ્યેન કિમપિ પાત્રં વોદ્ધું સર્વજનં નિવારયામાસ | 17
 લોકાનુપદિશન્ જગાદ, મમ ગૃહં સર્વજાતીયાનાં પ્રાર્થનાગૃહમ્ ઇતિ નામ્ના
 પ્રથિતં ભવિષ્યતિ એતત્ કિં શાસ્ત્રે લિખિતં નાસ્તિ? કિન્તુ યૂયં તદેવ
 યોરાણાં ગહ્લરં કુરુથ | 18 ઇમાં વાર્ણી શ્રુત્વાધ્યાપકાઃ પ્રધાનયાજકાશ્ચ
 તં યથા નાશયિતું શકનુવન્તિ તથોપાયં મૃગયામાસુઃ, કિન્તુ તસ્યોપદેશાત્
 સર્વે લોકા વિસ્મયં ગતા અતસ્તે તસ્માદ્ બિભ્યુઃ | 19 અથ સાયંસમય
 ઉપસ્થિતે યીશુર્નગરાદ્ બહિર્વગ્રાજ | 20 અનન્તરં પ્રાતઃકાલે તે તેન માર્ગેણ
 ગચ્છન્તસ્તમુડુમ્બરમહીરુહં સમૂલં શુષ્કં દદૃશુઃ | 21 તતઃ પિતરઃ પૂર્વવાક્યં
 સ્મરન્ યીશું બભાષં, હે ગુરો પશ્યતુ ય ઉડુમ્બરવિટપી ભવતા શપ્તઃ સ
 શુષ્કો બભૂવ | 22 તતો યીશુઃ પ્રત્યવાદીત્, યૂયમીશ્વરે વિશ્વસિત | 23
 યુષ્માનહં યથાર્થ વદામિ કોપિ યદ્યેતદ્ગિરિં વદતિ, ત્વમુત્થાય ગત્વા જલધૌ
 પત, પ્રોક્તમિદં વાક્યમવશ્યં ઘટિષ્યતે, મનસા કિમપિ ન સન્દિદ્ધ યેદિદં

विश्वसेत् तर्हि तस्य वाक्यानुसारेण तद् घटिष्यते। 24 अतो लेतोरहं
युष्मान् वस्मि, प्रार्थनाकाले यद्यदाकांक्षिष्यध्वे तत्तदवश्यं प्राप्स्यथ, एत्थं
विश्वसित, ततः प्राप्स्यथ। 25 अपरञ्च युष्मासु प्रार्थयितुं समुत्थितेषु
यदि कोपि युष्माकम् अपराधी तिष्ठति, तर्हि तं क्षमध्वं, तथा कृते युष्माकं
स्वर्गस्थः पितापि युष्माकमागांमि क्षमिष्यते। 26 किन्तु यदि न क्षमध्वे तर्हि
वः स्वर्गस्थः पितापि युष्माकमागांसि न क्षमिष्यते। 27 अनन्तरं ते पुन
रिंशालमं प्रविशिशुः, यीशु र्यदा मध्येमन्दिरेम् एतस्ततो गच्छति, तदानीं
प्रधानयाजका उपाध्यायाः प्राञ्चश्च तदन्तिकमेत्य कथामिमां पप्रच्छुः, 28 त्वं
केनादेशेन कर्माण्येतानि करोषि? तथैतानि कर्माणि कर्त्ता केनादिष्टोसि?
29 ततो यीशुः प्रतिगदितवान् अहमपि युष्मान् अेककथां पृच्छामि, यदि
यूयं तस्या उत्तरं कुरुथ, तर्हि कयाज्ञयाहं कर्माण्येतानि करोमि तद्
युष्मभ्यं कथयिष्यामि। 30 योहनो मज्जनम् एश्वरात् जातं किं मानवात्?
तन्मह्यं कथयत। 31 ते परस्परं विवेक्तुं प्रारंभिरे, तद् एश्वराद् बभूवेति
येद् वदामस्तर्हि कुतस्तं न प्रत्यैत? कथमेतां कथयिष्यति। 32 मानवाद्
अभवदिति येद् वदामस्तर्हि लोकेभ्यो भयमस्ति यतो लेतोः सर्वे योहनं
सत्यं भविष्यद्वादिनं मन्यन्ते। 33 अतएव ते यीशुं प्रत्यवादिषु र्वयं तद्
वक्तुं न शक्नुमः। यीशुरुवाच, तर्हि येनादेशेन कर्माण्येतानि करोमि,
अहमपि युष्मभ्यं तन्न कथयिष्यामि।

12 अनन्तरं यीशु दृष्टान्तेन तेभ्यः कथयितुमारंभे, कश्चिदेको द्राक्षाक्षेत्रं
विधाय तस्यतुर्दिक्षु वारणीं कृत्वा तन्मध्ये द्राक्षापेषणकुण्डम् अभनत्, तथा
तस्य गडमपि निर्मितवान् ततस्तत्क्षेत्रं कृषीवलेषु समर्थं दूरदेशं जगाम।
2 तदनन्तरं इलकाले कृषीवलेभ्यो द्राक्षाक्षेत्रइलानि प्राप्तुं तेषां सविधे भृत्यम्
अेकं प्राडिणोत्। 3 किन्तु कृषीवलास्तं धृत्वा प्रहृत्य रिक्तहस्तं विससृजुः। 4
ततः स पुनरन्यमेकं भृत्यं प्रषयामास, किन्तु ते कृषीवलाः पाषाणाघातैस्तस्य
शिरो भङ्क्त्वा सापमानं तं व्यसर्जन्। 5 ततः परं सोपरं दासं प्राडिणोत्
तदा ते तं जघ्नुः, अेवम् अनेकेषां कस्यचित् प्रहारः कस्यचिद् वधश्च तैः कृतः।
6 ततः परं मया स्वपुत्रे प्रदिते ते तमवश्यं सम्भंस्यन्ते, एत्युक्त्वावशेषे
तेषां सन्निधौ निजप्रियम् अद्वितीयं पुत्रं प्रेषयामास। 7 किन्तु कृषीवलाः
परस्परं जगदुः, अेष उत्तराधिकारी, आगच्छत वयमेनं उन्मस्तथा कृते

ડધિકારોયમ્ અસ્માકં ભવિષ્યતિ | 8 તતસ્તં ધૃત્વા હત્વા દ્રાક્ષાક્ષેત્રાદ્
 બહિઃ પ્રાક્ષિપન્ | 9 અનેનાસૌ દ્રાક્ષાક્ષેત્રપતિઃ કિં કરિષ્યતિ? સ એત્ય
 તાન્ કૃષીવલાન્ સંહત્ય તત્ક્ષેત્રમ્ અન્યેષુ કૃષીવલેષુ સમર્પયિષ્યતિ | 10
 અપરઞ્ચ, "સ્થપતયઃ કરિષ્યન્તિ ગ્રાવાણાં યન્તુ તુચ્છકં | પ્રાધાનપ્રસ્તરઃ કોણે
 સ એવ સંભવિષ્યતિ | 11 એતત્ કર્મ પરેશસ્યાંદ્ભૂતં નો દૃષ્ટિતો ભવેત્ | |
 " ઇમાં શાસ્ત્રીયાં લિપિં યૂયં કિં નાપાઠિષ્ઠ? 12 તદાનીં સ તાનુદ્દિશ્ય તાં
 દૃષ્ટાન્તકથાં કથિતવાન્, ત ઇત્યં બુદ્ધ્વા તં ધર્તામુધતાઃ, કિન્તુ લોકેભ્યો
 ભિભ્યુઃ, તદનન્તરં તે તં વિહાય વપ્રજુઃ | 13 અપરઞ્ચ તે તસ્ય વાક્યદોષં
 ધર્તા કતિપયાન્ ફિરુશિનો હેરોદીયાંશ્ચ લોકાન્ તદન્તિકં પ્રેષયામાસુઃ |
 14 ત આગત્ય તમવદન્, હે ગુરો ભવાન્ તથ્યભાષી કસ્યાપ્યનુરોધં ન
 મન્યતે, પક્ષપાતઞ્ચ ન કરોતિ, યથાર્થત ઈશ્વરીયં માર્ગં દર્શયતિ વયમેતત્
 પ્રજાનીમઃ, કૈસરાય કરો દેયો ન વાં? વયં દાસ્યામો ન વા? 15 કિન્તુ સ
 તેષાં કપટં જ્ઞાત્વા જગાદ, કુતો માં પરીક્ષધ્વે? એકં મુદ્રાપાદં સમાનીય માં
 દર્શયત | 16 તદા તૈરેકસ્મિન્ મુદ્રાપાદે સમાનીતે સ તાન્ પપ્રચ્છ, અત્ર
 લિખિતં નામ મૂર્તિં વાં કસ્ય? તે પ્રત્યૂચુઃ, કૈસરસ્ય | 17 તદા યીશુરવદત્
 તર્હિ કૈસરસ્ય દ્રવ્યાણિ કૈસરાય દત્ત, ઈશ્વરસ્ય દ્રવ્યાણિ તુ ઈશ્વરાય દત્ત;
 તતસ્તે વિસ્મયં મેનિરે | 18 અથ મૃતાનામુત્યાનં યે ન મન્યન્તે તે સિદ્ધકિનો
 યીશોઃ સમીપમાગત્ય તં પપ્રચ્છુઃ; 19 હે ગુરો કશ્ચિજ્જનો યદિ નિઃસન્તતિઃ
 સન્ ભાર્ય્યાયાં સત્યાં મિયતે તર્હિ તસ્ય ભ્રાતા તસ્ય ભાર્ય્યા ગૃહીત્વા ભ્રાતુ
 વંશોત્પત્તિં કરિષ્યતિ, વ્યવસ્થામિમાં મૂસા અસ્માન્ પ્રતિ વ્યલિખત્ | 20
 કિન્તુ કેચિત્ સપ્ત ભ્રાતર આસન્, તતસ્તેષાં જ્યેષ્ઠભ્રાતા વિવહ્ય નિઃસન્તતિઃ
 સન્ અમિયત | 21 તતો દ્વિતીયો ભ્રાતા તાં સ્ત્રિયમગૃહ્ણાત્ કિન્તુ સોપિ
 નિઃસન્તતિઃ સન્ અમિયત; અથ તૃતીયોપિ ભ્રાતા તાદૃશોભવત્ | 22 ઇત્યં
 સપ્તૈવ ભ્રાતરસ્તાં સ્ત્રિયં ગૃહીત્વા નિઃસન્તાનાઃ સન્તોડમિયન્ત, સર્વશેષે
 સાપિ સ્ત્રી મિયતે સ્મ | 23 અથ મૃતાનામુત્યાનકાલે યદા ત ઉત્યાસ્યન્તિ
 તદા તેષાં કસ્ય ભાર્ય્યા સા ભવિષ્યતિ? યતસ્તે સપ્તૈવ તાં વ્યવહન્ | 24
 તતો યીશુઃ પ્રત્યુવાય શાસ્ત્રમ્ ઈશ્વરશક્તિઞ્ચ યૂયમજ્ઞાત્વા કિમભ્રામ્યત
 ન? 25 મૃતલોકાનામુત્યાનં સતિ તે ન વિવહન્તિ વાગદત્તા અપિ ન ભવન્તિ,
 કિન્તુ સ્વર્ગીયદૂતાનાં સદૃશા ભવન્તિ | 26 પુનશ્ચ "અહમ્ ઇબ્રાહીમ ઈશ્વર

ઇસ્હાક ઇશ્વરો યાકૂબશ્ચેશ્વરઃ" યામિમાં કથાં સ્તમ્બમધ્યે તિષ્ઠન્ ઇશ્વરો
 મૂસામવાદીત્ મૃતાનામુત્થાનાર્થે સા કથા મૂસાલિખિતે પુસ્તકે કિં યુષ્માભિ
 નાંપાઠિ? 27 ઇશ્વરો જીવતાં પ્રભુઃ કિન્તુ મૃતાનાં પ્રભુર્ન ભવતિ, તસ્માદ્દેતો
 ર્થૂયં મહાભ્રમેણ તિષ્ઠથ | 28 એતર્હિ એકોધ્યાપક એત્ય તેષામિત્થં વિચારં
 શુશ્રાવઃ; યીશુસ્તેષાં વાક્યસ્ય સદ્ગુત્તરં દત્તવાન્ ઇતિ બુદ્ધ્વા તં પૃષ્ટવાન્
 સર્વાસામ્ આજ્ઞાનાં કા શ્રેષ્ઠા? તતો યીશુઃ પ્રત્યુવાચ, 29 "હે ઇસ્રાયેલ્લોકા
 અવધત્, અસ્માકં પ્રભુઃ પરમેશ્વર એક એવ, 30 યૂયં સર્વ્યન્તઃકરણૈઃ
 સર્વ્યપ્રાણૈઃ સર્વ્યચિત્તૈઃ સર્વ્યશક્તિભિશ્ચ તસ્મિન્ પ્રભૌ પરમેશ્વરે પ્રીયધ્વં,"
 ઇત્યાજ્ઞા શ્રેષ્ઠા | 31 તથા "સ્વપ્રતિવાસિનિ સ્વવત્ પ્રેમ કુરુધ્વં," એષા યા
 દ્વિતીયાજ્ઞા સા તાદૃશી; એતાભ્યાં દ્વાભ્યામ્ આજ્ઞાભ્યામ્ અન્યા કાપ્યાજ્ઞા
 શ્રેષ્ઠા નાસ્તિ | 32 તદા સોધ્યાપકસ્તમવદત્, હે ગુરો સત્યં ભવાન્ યથાર્થં
 પ્રોક્તવાન્ યત એકસ્માદ્ ઇશ્વરાદ્ અન્યો દ્વિતીય ઇશ્વરો નાસ્તિ; 33 અપરં
 સર્વાન્તઃકરણૈઃ સર્વ્યપ્રાણૈઃ સર્વ્યચિત્તૈઃ સર્વ્યશક્તિભિશ્ચ ઇશ્વરે પ્રેમકરણં
 તથા સ્વમીપવાસિનિ સ્વવત્ પ્રેમકરણઞ્ચ સર્વ્યેભ્યો હોમબલિદાનાદિભ્યઃ
 શ્રષ્ઠં ભવતિ | 34 તતો યીશુઃ સુબુદ્ધેરિવ તસ્યેદમ્ ઉત્તરં શ્રુત્વા તં ભાષિતવાન્
 ત્વમીશ્વરસ્ય રાજ્યાન્ન દૂરોસિ | ઇતઃ પરં તેન સહ કસ્યાપિ વાક્યસ્ય
 વિચારં કર્તા કસ્યાપિ પ્રગલ્ભતા ન જાતા | 35 અનન્તરં મધ્યેમન્દિરમ્
 ઉપદિશન્ યીશુરિમં પ્રશ્નં ચકાર, અધ્યાપકા અભિષિક્તં (તારકં) કુતો દાયૂદઃ
 સન્તાનં વદન્તિ? 36 સ્વયં દાયૂદ્ પવિત્રસ્યાત્મન આવેશેનેદં કથયામાસ |
 યથા | "મમ પ્રભુમિદં વાક્યવદત્ પરમેશ્વરઃ | તવ શત્રૂનહં યાવત્ પાદપીઠં
 કરોમિ ન | તાવત્ કાલં મદીયે ત્વં દક્ષપાર્શ્વ ઉપાવિશ | " 37 યદિ દાયૂદ્ તં
 પ્રભૂં વદતિ તર્હિ કથં સ તસ્ય સન્તાનો ભવિતુમર્હતિ? ઇતરે લોકાસ્તત્કથાં
 શ્રુત્વાનનન્દુઃ | 38 તદાનીં સ તાનુપદિશ્ય કથિતવાન્ યે નરા દીર્ઘપરિઘેયાનિ
 હટ્ટે વિપનૌ ચ 39 લોકકૃતનમસ્કારાન્ ભજનગૃહે પ્રધાનાસનાનિ ભોજનકાલે
 પ્રધાનસ્થાનાનિ ચ કાઙ્ક્ષન્તે; 40 વિધવાનાં સર્વ્યસ્વં ગ્રસિત્વા છલાદ્
 દીર્ઘકાલં પ્રાર્થયન્તે તેભ્ય ઉપાધ્યાયેભ્યઃ સાવધાના ભવતઃ; તેઽધિકતરાન્
 દણ્ડાન્ પ્રાપ્સ્યન્તિ | 41 તદનન્તરં લોકા ભાણ્ડાગારે મુદ્રા યથા નિક્ષિપન્તિ
 ભાણ્ડાગારસ્ય સમ્મુખે સમુપવિશ્ય યીશુસ્તદવલુલોકઃ; તદાનીં બહવો
 ધનિનસ્તસ્ય મધ્યે બહૂનિ ધનાનિ નિરક્ષિપન્ | 42 પશ્ચાદ્ એકા દરિદ્રા વિધવા

समागत्य द्विपराभूल्यां मुद्रैकां तत्र निरक्षिपत् | 43 तदा यीशुः शिष्यान्
 आडूय कथितवान् युष्मानहं यथार्थं वदामि ये ये भाएडागारेऽस्मिन् धनानि
 निःक्षिपन्ति स्म तेभ्यः सर्वेभ्य एयं विधवा दरिद्राधिकम् निःक्षिपति स्म |
 44 यतस्ते प्रभूतधनस्य किञ्चित् निरक्षिपन् किन्तु दीनेयं स्वदिनयापनयोग्यं
 किञ्चिदपि न स्थापयित्वा सर्वस्वं निरक्षिपत् |

13 अनन्तरं मन्दिराद् बहिर्गमनकाले तस्य शिष्याणामेकस्तं व्याहृतवान् ढे
 गुरो पश्यतु कीदृशाः पाषाणाः कीदृक् य निययनं | 2 तदा यीशुस्तम् अवदत्
 त्वं किमेतद् बृहन्निययनं पश्यसि? अस्त्यैकपाषाणोपि द्वितीयपाषाणोपरि
 न स्थास्यति सर्वे ऽधःक्षेप्यन्ते | 3 अथ यस्मिन् काले जैतुन्गिरौ मन्दिरस्य
 सम्भुभे स समुपविष्टस्तस्मिन् काले पितरो याडूब् योडन् आन्द्रियश्चैते
 तं रडसि प्रप्रच्छुः, 4 अेता घटनाः कदा भविष्यन्ति? तथैतत्सर्व्वासां
 सिद्ध्युपक्रमस्य वा किं चिह्नं? तदस्मभ्यं कथयतु भवान् | 5 ततो याशुस्तान्
 वक्तुमारंभे, कोपि यथा युष्मान् न ब्रामयति तथात्र यूयं सावधाना
 भवत | 6 यतः श्रीष्टोडमिति कथयित्वा मम नाम्नानेके समागत्य लोकानां
 भ्रमं जनयिष्यन्ति; 7 किन्तु यूयं रणस्य वार्तां रणाऽम्बरञ्च श्रुत्वा
 मा व्याडुला भवत, घटना अेता अवश्यम्भाविन्यः; किन्वापाततो न
 युगान्तो भविष्यति | 8 देशस्य विपक्षतया देशो राज्यस्य विपक्षतया
 य राज्यमुत्थास्यति, तथा स्थाने स्थाने भूमिकम्पो दुर्भिक्षं मडाकलेशाश्च
 समुपस्थास्यन्ति, सर्व्वे अेते दुःभस्यारम्भाः | 9 किन्तु यूयम् आत्मार्थे
 सावधानास्तिष्ठत, यतो लोका राजसभायां युष्मान् समर्पयिष्यन्ति, तथा
 भजनगृहे प्रडरिष्यन्ति; यूयं मर्दर्थे देशाधिपान् भूपांश्च प्रति साक्ष्यदानाय
 तेषां सम्भुभे उपस्थापयिष्यध्वे | 10 शेषीभवनात् पूर्व्वं सर्व्वान् देशीयान्
 प्रति सुसंवाहः प्रयारयिष्यते | 11 किन्तु यदा ते युष्मान् धृत्वा समर्पयिष्यन्ति
 तदा यूयं यधद् उत्तरं दास्यथ, तदग्र तस्य विवेचनं मा कुरुत तदर्थं किञ्चिदपि
 मा चिन्तयत य, तदानीं युष्माकं मनःसु यधद् वाक्यम् उपस्थापयिष्यते
 तदेव वद्विष्यथ, यतो यूयं न तद्वक्तारः किन्तु पवित्र आत्मा तस्य वक्ता |
 12 तदा भ्राता भ्रातरं पिता पुत्रं घातनार्थं परडस्तेषु समर्पयिष्यते, तथा
 पत्यानि मातापित्रो विपक्षतया तौ घातयिष्यन्ति | 13 मम नामडेतोः
 सर्व्वेषां सविधे यूयं जुगुप्सिता भविष्यथ, किन्तु यः कश्चित् शेषपर्य्यन्तं

ધૈર્યમ્ આલમ્બિષ્યતે સએવ પરિત્રાસ્યતે | 14 દાનિયેલ્ભવિષ્યદ્વાદિના
 પ્રોક્તં સર્વનાશિ જુગુપ્સિતઞ્ચ વસ્તુ યદા ત્વયોગ્યસ્થાને વિધમાનં દ્રક્ષથ
 (યો જનઃ પઠતિ સ બુધ્યતાં) તદા યે ચિહ્નૈયદેશે તિષ્ઠન્તિ તે મહીઘ્નં પ્રતિ
 પલાયન્તાં; 15 તથા યો નરો ગૃહોપરિ તિષ્ઠતિ સ ગૃહમધ્યં નાવરોહતુ,
 તથા કિમપિ વસ્તુ ગ્રહીતું મધ્યેગૃહં ન પ્રવિશતુ; 16 તથા ય યો નરઃ ક્ષેત્રે
 તિષ્ઠતિ સોપિ સ્વવસ્ત્રં ગ્રહીતું પરાવૃત્ય ન વ્રજતુ | 17 તદાનીં ગર્ભવતીનાં
 સ્તન્યદાત્રીણાઞ્ચ યોષિતાં દુર્ગતિ ભવિષ્યતિ | 18 યુષ્માકં પલાયનં શીતકાલે
 યથા ન ભવતિ તદર્થં પ્રાર્થયધ્વં | 19 યતસ્તદા યાદૃશી દુર્ઘટના ઘટિષ્યતે
 તાદૃશી દુર્ઘટના ઈશ્વરસૃષ્ટેઃ પ્રથમમારભ્યાધ યાવત્ કદાપિ ન જાતા ન
 જનિષ્યતે ચ | 20 અપરઞ્ચ પરમેશ્વરો યદિ તસ્ય સમયસ્ય સંક્ષેપં ન
 કરોતિ તર્હિ કસ્યાપિ પ્રાણભૃતો રક્ષા ભવિતું ન શક્યતિ, કિન્તુ યાન્ જનાન્
 મનોનીતાન્ અકરોત્ તેષાં સ્વમનોનીતાનાં હેતોઃ સ તદનેહસં સંક્ષેપ્યતિ |
 21 અન્યચ્ચ પશ્યત પ્ત્રીષ્ટોત્ર સ્થાને વા તત્ર સ્થાને વિધતે, તસ્મિન્કાલે
 યદિ કશ્ચિદ્ યુષ્માન્ એતાદૃશં વાક્યં વ્યાહરતિ, તર્હિ તસ્મિન્ વાક્યે ભૈવ
 વિશ્વસિત | 22 યતોનેકે મિથ્યાપ્ત્રીષ્ટા મિથ્યાભવિષ્યદ્વાદિનશ્ચ સમુપસ્થાય
 બહૂનિ ચિહ્નાન્યદ્ભુતાનિ કર્માણિ ચ દર્શયિષ્યન્તિ; તથા યદિ સમ્ભવતિ તર્હિ
 મનોનીતલોકાનામપિ મિથ્યામતિં જનયિષ્યન્તિ | 23 પશ્યત ઘટનાતઃ પૂર્વ્યં
 સર્વકાર્યસ્ય વાર્તા યુષ્મભ્યમદામ્, યૂયં સાવધાનાસ્તિષ્ઠત | 24 અપરઞ્ચ
 તસ્ય કલેશકાલસ્યાવ્યવહિતે પરકાલે ભાસ્કરઃ સાન્ધકારો ભવિષ્યતિ
 તથૈવ ચન્દ્રશ્ચન્દ્રિકાં ન દાસ્યતિ | 25 નભઃસ્થાનિ નક્ષત્રાણિ પતિષ્યન્તિ,
 વ્યોમમાણ્ડલસ્થા ગ્રહાશ્ચ વિચલિષ્યન્તિ | 26 તદાનીં મહાપરાક્રમેણ
 મહેશ્વર્યોણ ચ મેઘમારુહ્ય સમાયાન્તં માનવસુતં માનવાઃ સમીક્ષિષ્યન્તે | 27
 અન્યચ્ચ સ નિજદૂતાન્ પ્રહિત્ય નભોભૂમ્યોઃ સીમાં યાવદ્ જગતશ્ચતુર્દિગ્ભ્યઃ
 સ્વમનોનીતલોકાન્ સંગ્રહીષ્યતિ | 28 ઉડુમ્બરતરો દૃષ્ટાન્તં શિક્ષધ્વં
 યદોડુમ્બરસ્ય તરો નવીનાઃ શાખા જાયન્તે પલ્લવાદીનિ ચ નિગચ્છન્તિ,
 તદા નિદાઘકાલઃ સવિધો ભવતીતિ યૂયં જ્ઞાતું શકનુથ | 29 તદ્વદ્ એતા
 ઘટના દૃષ્ટ્વા સ કાલો દ્વાર્યુપસ્થિત ઇતિ જાનીત | 30 યુષ્માનહં યથાર્થં
 વદામિ, આધુનિકલોકાનાં ગમનાત્ પૂર્વ્યં તાનિ સર્વાણિ ઘટિષ્યન્તે | 31
 ધાવાપૃથિવ્યો વિચલિતયોઃ સત્યો ભદીયા વાણી ન વિચલિષ્યતિ | 32

अपरञ्च स्वर्गस्थदूतगणो वा पुत्रो वा तातादन्यः कोपि तं द्विवसं तं दण्डं वा न ज्ञापयति। 33 अतः स समयः कदा भविष्यति, अतज्ज्ञानात्मावाद् यूयं सावधानास्तिष्ठत, सतर्काश्च भूत्वा प्रार्थयध्वं; 34 यद्वत् कश्चित् पुमान् स्वनिवेशनाद् दूरदेशं प्रति यात्राकरणकाले दासेषु स्वकार्यस्य भारमर्पयित्वा सर्वान् स्वे स्वे कर्म्मणि नियोजयति; अपरं दौवारिकं जागरितुं समादिश्य याति, तद्वन् नरपुत्रः। 35 गृहपतिः सायंकाले निशीथे वा तृतीययामे वा प्रातःकाले वा कदागमिष्यति तद् यूयं न जानीथ; 36 स उदागत्य यथा युष्मान् निद्रितान् न पश्यति, तदर्थं जागरितास्तिष्ठत। 37 युष्मानहं यद् वदामि तदेव सर्वान् वदामि, जागरितास्तिष्ठतेति।

14 तदा निस्तारोत्सवकिण्वलीनपूपोत्सवयोरारम्भस्य दिनद्वये ऽवशिष्टे प्रधानयाजका अध्यापकाश्च केनापि छलेन यीशुं धर्त्ता हन्तुञ्च मृगयाञ्चकिरे; 2 किन्तु लोकानां कलहभयादूचिरे, नयोत्सवकाल उचितमेतदिति। 3 अनन्तरं वैथनियापुरे शिमोनकुष्ठिनो गृहे योशौ भोक्तुमुपविष्टे सति काश्चिद् योषित् पाण्डुरपाषाणस्य सम्पुटकेन मण्डार्थोत्तमतैलम् आनीय सम्पुटकं भङ्क्त्वा तस्योत्तमाङ्गे तैलधारं पातयाञ्चके। 4 तस्मात् केचित् स्वान्ते कुप्यन्तः कथितवन्तः कुतोयं तैलापव्ययः? 5 यद्येतत् तैल व्यङ्क्ष्यत तर्हि मुद्रापादशतत्रयाद्यधिकं तस्य प्राप्तमूल्यं दरिद्रलोकैभ्यो दातुमशक्यत, कथामेतां कथयित्वा तथा योषिता साकं वाय्यायुहन्। 6 किन्तु यीशुरुवाच, कुत अेतस्यै कृच्छ्रं ददासि? मह्यमियं कर्म्मोत्तमं कृतवती। 7 दरिद्राः सर्व्वदा युष्माभिः सङ् तिष्ठन्ति, तस्माद् यूयं यद्येच्छथ तदैव तानुपकर्त्ता शक्नुथ, किन्त्वहं युष्माभिः सङ् निरन्तरं न तिष्ठामि। 8 अस्या यथासाध्यं तथैवाकरोदियं, श्मशानयापनात् पूर्वं समेत्य मद्रुपुषि तैलम् अमर्दयत्। 9 अहं युष्मत्भ्यं यथार्थं कथयामि, जगतां मध्ये यत्र यत्र सुसंवाद्येयं प्रयारयिष्यते तत्र तत्र योषित अेतस्याः स्मरणार्थं तद्दृत्कर्म्मैतत् प्रयारयिष्यते। 10 ततः परं द्वादशानां शिष्याणामेकं षष्करियोतीययिडूदाभ्यो यीशुं परकरेषु समर्पयितुं प्रधानयाजकानां समीपमियाय। 11 ते तस्य वाक्यं समाकर्ण्य सन्तुष्टाः सन्तस्तस्मै मुद्रा दातुं प्रत्यजानत; तस्मात् स तं तेषां करेषु समर्पणायोपायं मृगयामास। 12 अनन्तरं किण्वशून्यपूपोत्सवस्य

પ્રથમેડહનિ નિસ્તારોત્મવાર્થ મેષમારણાસમયે શિષ્યાસ્તં પપ્રચ્છઃ કુત્ર
 ગત્વા વયં નિસ્તારોત્સવસ્ય ભોજ્યમાસાદયિષ્યામઃ? કિમિચ્છતિ ભવાન્?
 13 તદાનીં સ તેષાં દ્વયં પ્રેરયન્ બભાષે યુવયોઃ પુરમધ્યં ગતયોઃ સતો યો
 જનઃ સજલકુમ્ભં વહન્ યુવાં સાક્ષાત્ કરિષ્યતિ તસ્યૈવ પશ્ચાદ્ યાતં;
 14 સ યત્ સદનં પ્રવેક્ષ્યતિ તદ્ભવનપતિં વદતં, ગુરુરાહ યત્ર સશિષ્યોહં
 નિસ્તારોત્સવીયં ભોજનં કરિષ્યામિ, સા ભોજનશાલા કુત્રાસ્તિ? 15 તતઃ સ
 પરિષ્કૃતાં સુસજ્જિતાં બૃહતીયઞ્ચ યાં શાલાં દર્શયિષ્યતિ તસ્યામસ્મદર્થં
 ભોજ્યદ્રવ્યાણ્યાસાદયતં | 16 તતઃ શિષ્યૌ પ્રસ્થાય પુરં પ્રવિશ્ય સ
 યથોક્તવાન્ તથૈવ પ્રાપ્ય નિસ્તારોત્સવસ્ય ભોજ્યદ્રવ્યાણિ સમાસાદયેતામ્ |
 17 અનન્તરં યીશુઃ સાયંકાલે દ્વાદશભિઃ શિષ્યૈઃ સાદ્ધ્ જગામ; 18 સર્વેષુ
 ભોજનાય પ્રોપવિષ્ટેષુ સ તાનુદિતવાન્ યુષ્માનહં યથાર્થં વ્યાહરામિ, અત્ર
 યુષ્માકમેકો જનો યો મયા સહ ભુંક્તે માં પરકરેષુ સમર્પયિષ્યતે | 19 તદાનીં
 તે દુઃખિતાઃ સન્ત એકૈકશસ્તં પ્રજુમારબ્ધવન્તઃ સ કિમહં? પશ્ચાદ્ અન્ય
 એકોભિદધે સ કિમહં? 20 તતઃ સ પ્રત્યવદદ્ એતેષાં દ્વાદશાનાં યો જનો મયા
 સમં ભોજનાપાત્રે પાણિં મજ્જયિષ્યતિ સ એવ | 21 મનુજતનયમધિ યાદૃશં
 લિખિતમાસ્તે તદનુરૂપા ગતિસ્તસ્ય ભવિષ્યતિ, કિન્તુ યો જનો માનવસુતં
 સમર્પયિષ્યતે હન્ત તસ્ય જન્માભાવે સતિ ભદ્રમભવિષ્યત્ | 22 અપરઞ્ચ
 તેષાં ભોજનસમયે યીશુઃ પૂપં ગૃહીત્વેશ્વરગુણાન્ અનુકીર્ત્ય ભડ્કત્વા
 તેભ્યો દત્વા બભાષે, એતદ્ ગૃહીત્વા ભુઞ્જીધ્વમ્ એતન્મમ વિગ્રહરૂપં | 23
 અનન્તરં સ કંસં ગૃહીત્વેશ્વરસ્ય ગુણાન્ કીર્તયિત્વા તેભ્યો દદૌ, તતસ્તે સર્વે
 પપુઃ | 24 અપરં સ તાનવાદીદ્ બહૂનાં નિમિત્તં પાતિતં મમ નવીનનિયમરૂપં
 શોણિતમેતત્ | 25 યુષ્માનહં યથાર્થં વદામિ, ઈશ્વરસ્ય રાજ્યે યાવત્
 સધોજાતં દ્રાક્ષારસં ન પાસ્યામિ, તાવદહં દ્રાક્ષાફલરસં પુનર્ન પાસ્યામિ |
 26 તદનન્તરં તે ગીતમેકં સંગીય બહિ જેતુનં શિખરિણં યયુઃ 27 અથ
 યીશુસ્તાનુવાય નિશાયામસ્યાં મયિ યુષ્માકં સર્વેષાં પ્રત્યૂહો ભવિષ્યતિ
 યતો લિખિતમાસ્તે યથા, મેષાણાં રક્ષકઞ્ચાહં પ્રહરિષ્યામિ વૈ તતઃ | મેષાણાં
 નિવહો નૂનં પ્રવિકીર્ણો ભવિષ્યતિ | 28 કન્તુ મદ્દુત્યાને જાતે યુષ્માકમગ્રેડહં
 ગાલીલં ગ્રજિષ્યામિ | 29 તદા પિતરઃ પ્રતિબભાષે, યદપિ સર્વેષાં પ્રત્યૂહો
 ભવતિ તથાપિ મમ નૈવ ભવિષ્યતિ | 30 તતો યીશુરુક્તાવાન્ અહં તુભ્યં

તથ્યં કથયામિ, ક્ષણાદાયામધ કુક્કુટસ્ય દ્વિતીયવારરવાણાત્ પૂર્વ્યં ત્વં
 વારત્રયં મામપહ્નોષ્યસે | 31 કિન્તુ સ ગાઠં વ્યાહરદ્ યદપિ ત્વયા સાદ્ધ્
 મમ પ્રાણો યાતિ તથાપિ કથમપિ ત્વાં નાપહ્નોષ્યે; સર્વ્યેડપીતરે તથૈવ
 બભાષિરે | 32 અપરઞ્ચ તેષુ ગેત્શિમાનીનામકં સ્થાન ગતેષુ સ શિષ્યાન્
 જગાદ, યાવદહં પ્રાર્થયે તાવદત્ર સ્થાને યૂયં સમુપવિશત | 33 અથ સ
 પિતરં યાકૂબં યોહનઞ્ચ ગૃહીત્વા વપ્રાજ; અત્યન્તં ત્રાસિતો વ્યાકુલિતશ્ચ
 તેભ્યઃ કથયામાસ, 34 નિધનકાલવત્ પ્રાણો મેડતીવ દુઃખમેતિ, યૂયં
 જાત્રોત્ર સ્થાને તિષ્ઠત | 35 તતઃ સ કિઞ્ચિદ્દૂરં ગત્વા ભૂમાવધોમુખઃ પતિત્વા
 પ્રાર્થિતવાનેતત્, યદિ ભવિતું શક્યં તર્હિ દુઃખસમયોયં મત્તો દૂરીભવતુ | 36
 અપરમુદિતવાન્ હે પિત હે પિતઃ સર્વ્યે ત્વયા સાધ્યં, તતો હેતોરિમં કંસં
 મત્તો દૂરીકુરુ, કિન્તુ તન્ મમેચ્છાતો ન તવેચ્છાતો ભવતુ | 37 તતઃ પરં
 સ એત્ય તાન્ નિદ્રિતાન્ નિરીક્ષ્ય પિતરં પ્રોવાય, શિમોન્ ત્વં કિં નિદ્રાસિ?
 ઘટિકામેકામ્ અપિ જાગરિતું ન શક્નોષિ? 38 પરીક્ષાયાં યથા ન પતથ તદર્થં
 સયેતનાઃ સન્તઃ પ્રાર્થયધ્વં; મન ઉધુક્તમિતિ સત્યં કિન્તુ વપુરશક્તિકં |
 39 અથ સ પુનર્નજિત્વા પૂર્વ્યવત્ પ્રાર્થયાઞ્ચકે | 40 પરાવૃત્યાગત્ય પુનરપિ
 તાન્ નિદ્રિતાન્ દદર્શ તદા તેષાં લોચનાનિ નિદ્રયા પૂર્ણાનિ, તસ્માત્તસ્મૈ
 કા કથા કથયિતવ્યા ત એતદ્ બોદ્ધું ન શેકુઃ | 41 તતઃ પરં તૃતીયવારં
 આગત્ય તેભ્યો ડકથયદ્ ઇદાનીમપિ શયિત્વા વિશ્રામ્યથ? યથેષ્ટં જાતં,
 સમયશ્ચોપસ્થિતઃ પશ્યત માનવતનયઃ પાપિલોકાનાં પાણિષુ સમર્પ્યતે | 42
 ઉત્તિષ્ઠત, વયં વ્રજામો યો જનો માં પરપાણિષુ સમર્પયિષ્યતે પશ્યત સ
 સમીપમાયાતઃ | 43 ઇમાં કથાં કથયતિ સ, એતર્હિદ્વાદશાનામેકો ચિહ્નુદા
 નામા શિષ્યઃ પ્રધાનયાજકાનામ્ ઉપાધ્યાયાનાં પ્રાચીનલોકાનાઞ્ચ સન્નિધેઃ
 ખજ્જલગુડધારિણો બહુલોકાન્ ગૃહીત્વા તસ્ય સમીપ ઉપસ્થિતવાન્ |
 44 અપરઞ્ચાસૌ પરપાણિષુ સમર્પયિતા પૂર્વ્યમિતિ સક્ટેતં કૃતવાન્ યમહં
 યુમ્બિષ્યામિ સ એવાસૌ તમેવ ઘૃત્વા સાવધાનં નયત | 45 અતો હેતોઃ સ
 આગત્યૈવ યોશોઃ સવિધં ગત્વા હે ગુરો હે ગુરો, ઇત્યુક્ત્વા તં યુયુમ્બ |
 46 તદા તે તદ્દુપરિ પાણીનર્પયિત્વા તં દધ્નુઃ | 47 તતસ્તસ્ય પાર્શ્વસ્થાનાં
 લોકાનામેકઃ ખજ્જં નિષ્કોષયન્ મહાયાજકસ્ય દાસમેકં પ્રહત્ય તસ્ય કર્ણ
 ચિચ્છેદ | 48 પશ્ચાદ્ યીશુસ્તાન્ વ્યાજહાર ખજ્જાન્ લગુડાંશ્ચ ગૃહીત્વા માં કિં

ચૌરં ધર્તાં સમાયાતાઃ? 49 મધ્યેમન્દિરં સમુપદિશન્ પ્રત્યહં યુષ્માભિઃ સહ
 સ્થિતવાનતહં, તસ્મિન્ કાલે યૂયં માં નાદીધરત, કિન્તવનેન શાસ્ત્રીયં વચનં
 સેધનીયં | 50 તદા સર્વે શિષ્યાસ્તં પરિત્યજ્ય પલાયાઞ્ચકિરે | 51 અથૈકો
 યુવા માનવો નગ્નકાયે વસ્ત્રમેકં નિધાય તસ્ય પશ્ચાદ્ વ્રજન્ યુવલોકૈર્ ધૃતો 52
 વસ્ત્રં વિહાય નગ્નઃ પલાયાઞ્ચકે | 53 અપરઞ્ચ યસ્મિન્ સ્થાને પ્રધાનયાજકા
 ઉપાધ્યાયાઃ પ્રાચીનલોકાશ્ચ મહાયાજકેન સહ સદસિ સ્થિતાસ્તસ્મિન્
 સ્થાને મહાયાજકસ્ય સમીપં યીશું નિન્યુઃ | 54 પિતરો દૂરે તત્પશ્ચાદ્ ઇત્વા
 મહાયાજકસ્યાટ્ટાલિકાં પ્રવિશ્ય કિઙ્કરૈઃ સહોપવિશ્ય વહ્નિતાપં જગ્રાહ | 55
 તદાનીં પ્રધાનયાજકા મન્ત્રિણશ્ચ યીશું ઘાતયિતું તત્પ્રાતિકૂલ્યેન સાક્ષિણો
 મૃગયાઞ્ચકિરે, કિન્તુ ન પ્રાપ્તાઃ | 56 અનેકૈસ્તદ્વિરુદ્ધં મૃષાસાક્ષ્યે દત્તેપિ
 તેષાં વાક્યાનિ ન સમગચ્છન્ત | 57 સર્વશેષે કિયન્ત ઉત્થાય તસ્ય
 પ્રાતિકૂલ્યેન મૃષાસાક્ષ્યં દત્વા કથયામાસુઃ, 58 ઇદં કરકૃતમન્દિરં વિનાશ્ય
 દિનત્રયમધ્યે પુનરપરમ્ અકરકૃતં મન્દિરં નિર્માસ્યામિ, ઇતિ વાક્યમ્
 અસ્ય મુખાત્ શ્રુતમસ્માભિરિતિ | 59 કિન્તુ તત્રાપિ તેષાં સાક્ષ્યકથા ન
 સજ્ઞાતાઃ | 60 અથ મહાયાજકો મધ્યેસભમ્ ઉત્થાય યીશું વ્યાજહાર, એતે
 જનાસ્ત્વયિ યત્ સાક્ષ્યમદુઃ ત્વમેતસ્ય કિમપ્યુત્તરં કિં ન દાસ્યસિ? 61
 કિન્તુ સ કિમપ્યુત્તરં ન દત્વા મૌનીભૂય તસ્યૌ; તતો મહાયાજકઃ પુનરપિ તં
 પૃષ્ટવાન્ ત્વં સચ્ચિદાનન્દસ્ય તનયો ડભિષિક્તસ્ત્રતા? 62 તદા યીશુસ્તં
 પ્રોવાય ભવામ્યહમ્ યૂયઞ્ચ સર્વશક્તિમતો દક્ષીણપાશ્વે સમુપવિશન્તં મેઘ
 મારુહ્ય સમાયાન્તઞ્ચ મનુષ્યપુત્રં સન્દ્રક્ષ્યથ | 63 તદા મહાયાજકઃ સ્વં વમનં
 છિત્વા વ્યાવહરત્ 64 કિમસ્માકં સાક્ષિભિઃ પ્રયોજનમ્? ઇશ્વરનિન્દાવાક્યં
 યુષ્માભિરશ્રાવિ કિં વિચારયથ? તદાનીં સર્વે જગદુરયં નિધનદણ્ડમર્હતિ |
 65 તતઃ કશ્ચિત્ કશ્ચિત્ તદ્વપુષિ નિષ્ઠીવં નિચિક્ષેપ તથા તન્મુખમાચ્છાધ
 ચપેટેન હત્વા ગદિતવાન્ ગણયિત્વા વદ, અનુચરાશ્ચ ચપેટૈસ્તમાજઘ્નુઃ 66
 તતઃ પરં પિતરેડટ્ટાલિકાઘઃકોષ્ઠે તિષ્ઠતિ મહાયાજકસ્યૈકા દાસી સમેત્ય 67 તં
 વિહ્નિતાપં ગૃહ્ણન્તં વિલોક્ય તં સુનિરીક્ષ્ય બભાષે ત્વમપિ નાસરતીયયીશોઃ
 સઙ્ગિનામ્ એકો જન આસીઃ | 68 કિન્તુ સોપહ્ણત્ય જગાદ તમહં ન વદ્મિ
 ત્વં યત્ કથયમિ તદપ્યહં ન બુદ્ધ્યે | તદાનીં પિતરે ચત્વરં ગતવતિ કુક્કુટો
 રુરાવ | 69 અથાન્યા દાસી પિતરં દૃષ્ટ્વા સમીપસ્થાન્ જનાન્ જગાદ અયં

तेषामेको जनः | 70 ततः स द्वितीयवारम् अपहृतवान् पश्चात् तत्रस्था
लोकाः पितरं प्रोयुस्त्वमवश्यं तेषामेको जनः यतस्त्वं गालीलीयो नर इति
तवोव्याख्यानं प्रकाशयति | 71 तदा स शपथाभिशापौ कृत्वा प्रोवाय यूयं
कथां कथयथ तं नरं न जानेऽहं | 72 तदानीं द्वितीयवारं कुक्कुटो ऽरावीत् |
कुक्कुटस्य द्वितीयरवात् पूर्व्वं त्वं मां वारत्रयम् अपह्नोष्यसि, इति यद्वाक्यं
यीशुना समुदितं तत् तदा संस्मृत्य पितरो रोदितुम् आरभत |

15 अथ प्रभाते सति प्रधानयाजकाः प्राञ्ज उपाध्यायाः सर्व्वे मन्त्रिणश्च
सत्मां कृत्वा यीशुं बन्धयित्वा पीलाताप्यस्य देशाधिपतेः सविधं नीत्वा
समर्पयामासुः | 2 तदा पीलातस्तं पृष्टवान् त्वं किं यिद्धूदीयलोकानां राजा?
ततः स प्रत्युक्तवान् सत्यं वदसि | 3 अपरं प्रधानयाजकास्तस्य बह्वेषु
वाक्येषु दोषमारोपयाञ्जुः किन्तु स किमपि न प्रत्युवाय | 4 तदानीं
पीलातस्तं पुनः पप्रच्छ त्वं किं नोत्तरयसि? पश्यैते त्वद्विरुद्धं कतिपु साध्येषु
साक्षं ददति | 5 कन्तु यीशुस्तदापि नोत्तरं ददौ ततः पीलात आश्चर्य्यं
जगाम | 6 अपरञ्च काराबद्धे कस्तिंश्चित् जने तन्महोत्सवकाले लोकै र्यायिते
देशाधिपतिस्तं भोगयति | 7 ये य पूर्व्वमुपप्लवमकार्षुर्पुप्लवे वधमपि
कृतवन्तस्तेषां मध्ये तदानीं बरब्बानामक अेको बद्ध आसीत् | 8 अतो
हेतोः पूर्व्वपरीयां रीतिकथां कथयित्वा लोका उच्यैरुवन्तः पीलातस्य समक्षं
निवेदयामासुः | 9 तदा पीलातस्तानायप्यौ तर्हि किं यिद्धूदीयानां राजानं
भोगयिष्यामि? युष्माभिः किमिष्यते? 10 यतः प्रधानयाजका षर्ष्यात अेव
यीशुं समर्पयन्निति स विवेद | 11 किन्तु यथा बरब्बां भोगयति तथा
प्रार्थयितुं प्रधानयाजका लोकान् प्रवर्त्तयामासुः | 12 अथ पीलातः पुनः
पृष्टवान् तर्हि यं यिद्धूदीयानां राजेति वदथ तस्य किं करिष्यामि युष्माभिः
किमिष्यते? 13 तदा ते पुनरपि प्रोच्यैः प्रोयुस्तं कुशे वेधय | 14 तस्मात्
पीलातः कथितवान् कुतः? स किं कुकर्म्म कृतवान्? किन्तु ते पुनश्च रुवन्तो
व्याजहस्तं कुशे वेधय | 15 तदा पीलातः सर्व्वाल्लोकान् तोषयितुमिच्छन्
बरब्बां भोगयित्वा यीशुं कशाभिः प्रहृत्य कुशे वेद्धुं तं समर्पयाम्बभूव | 16
अनन्तरं सैन्यगणोऽट्टालिकाम् अर्थाद् अधिपते गृहं यीशुं नीत्वा सेनानिवहं
समाह्वयत् | 17 पश्चात् ते तं धूमलवार्णवस्त्रं परिधाप्य काण्टकमुकुटं
रययित्वा शिरसि समारोप्य 18 हे यिद्धूदीयानां राजन् नमस्कार इत्युक्त्वा

તં નમસ્કર્તામારેભિરે | 19 તસ્યોત્તમાઙ્ગે વેત્રાઘાતં ચક્રુસ્તદ્વાત્રે નિષ્ઠીવઞ્ચ
 નિચિક્ષિપુઃ, તથા તસ્ય સમ્મુખે જાનુપાતં પ્રણોમુઃ 20 ઇત્યમુપહસ્ય
 ધૂમ્રવર્ણવસ્ત્રમ્ ઉત્તાર્ય તસ્ય વસ્ત્રં તં પર્યઘાપયન્ કુશે વેદ્ધું બહિર્નિન્યુશ્ચ |
 21 તતઃ પરં સેકન્દરસ્ય રુદ્રસ્ય ચ પિતા શિમોન્નામા કુરીણીયલોક એકઃ
 કુતશ્ચિદ્ ગ્રામાદેત્ય પથિ યાતિ તં તે યીશોઃ કુશં વોદ્ધું બલાદ્ દધ્નુઃ |
 22 અથ ગુલ્ગલ્તા અર્થાત્ શિરઃકપાલનામકં સ્થાનં યીશુમાનીય 23 તે
 ગન્ધરસમિશ્રિતં દ્રાક્ષારસં પાતું તસ્મૈ દદ્ધુઃ કિન્તુ સ ન જગ્રાહ | 24 તસ્મિન્
 કુશે વિદ્ધે સતિ તેષામેકૈકશઃ કિં પ્રાપ્સ્યતીતિ નિર્ણયાય 25 તસ્ય પરિઘેયાનાં
 વિભાગાર્થં ગુટિકાપાતં ચક્રુઃ | 26 અપરમ્ એષ ચિહ્નૈયાનાં રાજેતિ લિખિતં
 દોષપત્રં તસ્ય શિરઃકર્ણવ્યમ્ આરોપયાન્નક્રુઃ | 27 તસ્ય વામદક્ષિણયો
 દ્વૌ ચૌરૌ કુશયો વિવિધાતે | 28 તેનૈવ "અપરાધિજનૈઃ સાર્દ્ધં સ ગણિતો
 ભવિષ્યતિ," ઇતિ શાસ્ત્રોક્તં વચનં સિદ્ધમભૂત | 29 અનન્તરં માર્ગે યે યે
 લોકા ગમનાગમને ચક્રુસ્તે સર્વ્વ એવ શિરાંસ્થાન્દોલ્ય નિન્દન્તો જગદ્ધુઃ, રે
 મન્દિરનાશક રે દિનત્રયમધ્યે તન્નિર્માયક, 30 અધુનાત્માનમ્ અવિત્વા
 કુશાદવરોહ | 31 કિન્ન પ્રધાનયાજકા અધ્યાપકાશ્ચ તદ્વત્ તિરસ્કૃત્ય
 પરસ્પરં ચચક્ષિરે એષ પરનાવત્ કિન્તુ સ્વમવિતું ન શક્નોતિ | 32
 યદીસ્રાયેલો રાજાભિષિક્તસ્ત્રાતા ભવતિ તર્હાધુનૈન કુશાદવરોહતુ વયં તદ્
 દૃષ્ટ્વા વિશ્વસિષ્યામઃ; કિન્ન યૌ લોકૌ તેન સાર્દ્ધં કુશે ડવિધ્યેતાં તાવપિ તં
 નિર્ભર્ત્સ્યામાસતુઃ | 33 અથ દ્વિતીયયામાત્ તૃતીયયામં યાવત્ સર્વ્વો દેશઃ
 સાન્ધકારોભૂત્ | 34 તતસ્તૃતીયપ્રહરે યીશુરુચ્યૈરવદત્ એલી એલી લામા
 શિવક્તની અર્થાદ્ "હે મદીશ મદીશ ત્વં પર્ય્યાક્ષીઃ કુતો હિ માં?" 35
 તદા સમીપસ્થલોકાનાં કેચિત્ તદ્વાક્યં નિશમ્યાયખ્યુઃ પશ્યૈષ એલિયમ્
 આહૂયતિ | 36 તત એકો જનો ધાવિત્વાગત્ય સ્પન્ને ડમ્લરસં પૂરયિત્વા
 તં નડાગ્રે નિધાય પાતું તસ્મૈ દત્વાવદત્ તિષ્ઠ એલિય એનમવરોહયિતુમ્
 એતિ ન વેતિ પશ્યામિ | 37 અથ યીશુરુચ્યૈઃ સમાહૂય પ્રાણાન્ જહૌ |
 38 તદા મન્દિરસ્ય જવનિકોદ્વ્યાદધઃચ્યન્તા વિદીર્ણા દ્વિખણ્ડાભૂત્ | 39
 કિન્ન ઇત્યમુચ્યૈરાહૂય પ્રાણાન્ ત્યજન્તં તં દૃષ્ટ્વા તદ્રક્ષણાય નિયુક્તો યઃ
 સેનાપતિરાસીત્ સોવદત્ નરોયમ્ ઇશ્વરપુત્ર ઇતિ સત્યમ્ | 40 તદાનીં
 મગ્દલીની મરિસમ્ કનિષ્ઠયાકૂબો યોસેશ્ચ માતાન્યમરિયમ્ શાલોમી ય યાઃ

સ્ત્રિયો 41 ગાલીલપ્રદેશે યીશુ સેવિત્વા તદનુગામિન્યો જાતા ઇમાસ્તદન્યાશ્ચ
 યા અનેકા નાર્યો યીશુના સાદ્ધ્ ચિરુશાલમમાયાતાસ્તાશ્ચ દૂરાત્ તાનિ
 દદૃશુઃ | 42 અથાસાદનદિનસ્યાર્થાદ્ વિશ્રામવારાત્ પૂર્વદિનસ્ય સાયંકાલ
 આગત 43 ઇશ્વરરાજ્યાપેક્ષરિમથીયયૂષ્કનામા માન્યમન્ત્રી સમેત્ય
 પીલાતસવિધં નિર્ભયો ગત્વા યીશોદેહં યચાયે | 44 કિન્તુ સ ઇદાનીં મૃતઃ
 પીલાત ઇત્યસમ્ભવં મત્વા શતસેનાપતિમાહૂય સ કદા મૃત ઇતિ પપ્રચ્છ |
 45 શતસેમનાપતિમુખાત્ તજ્ઞાત્વા યૂષ્કે યીશોદેહં દદૌ | 46 પશ્ચાત્
 સ સૂક્ષ્મં વાસઃ ક્રીત્વા યીશોઃ કાયમવરોહ્ય તેન વાસસા વેષ્ટાયિત્વા ગિરૌ
 ખાતશ્મશાને સ્થાપિતવાન્ પાષાણં લોઠયિત્વા દ્વારિ નિદધે | 47 કિન્તુ યત્ર
 સોસ્થાપ્યત તત મગ્દલીની મરિયમ્ યોસિમાતૃમરિયમ્ ચ દદૃશતઃ |

16 અથ વિશ્રામવારે ગતે મગ્દલીની મરિયમ્ યાકૂબમાતા મરિયમ્ શાલોમી
 ચેમાસ્તં મર્દયિતું સુગન્ધિદ્રવ્યાણિ ક્રીત્વા 2 સપ્તાહપ્રથમદિનેડતિપ્રત્યૂષે
 સૂર્યોદયકાલે શ્મશાનમુપગતાઃ | 3 કિન્તુ શ્મશાનદ્વારપાષાણોડતિબૃહન્
 તં કોડપસારયિચ્ચતીતિ તાઃ પરસ્પરં ગદન્તિ! 4 એતર્હિ નિરીક્ષ્ય
 પાષાણો દ્વારો ડપસારિત ઇતિ દદૃશુઃ | 5 પશ્ચાત્તાઃ શ્મશાનં પ્રવિશ્ય
 શુક્લવાર્ણાદીર્ઘપરિચ્છદાવૃતમેકં યુવાનં શ્મશાનદક્ષિણપાર્શ્વ ઉપવિષ્ટં દૃષ્ટ્વા
 યમચ્યક્રુઃ | 6 સોડવદત્, માભૈષ્ટ યૂયં ક્રુશે હતં નાસરતીયયીશુ ગવેષયથ
 સોત્ર નાસ્તિ શ્મશાનાદુદ્વસ્થાત્; તૈ ર્યત્ર સ સ્થાપિતઃ સ્થાનં તદિદં પશ્યત | 7
 કિન્તુ તેન યથોક્તં તથા યુષ્માકમગ્રે ગાલીલં યાસ્યતે તત્ર સ યુષ્માન્ સાક્ષાત્
 કરિષ્યતે યૂયં ગત્વા તસ્ય શિષ્યેભ્યઃ પિતરાય ચ વાર્તામિમાં કથયત | 8 તાઃ
 કમ્પિતા વિસ્તિતાશ્ચ તૂર્ણાં શ્મશાનાદ્ બહિર્ગત્વા પલાયન્ત ભયાત્ કમપિ
 કિમપિ નાવદંશ્ચ | 9 (note: The most reliable and earliest manuscripts do not
 include Mark 16:9-20.) અપરં યીશુઃ સપ્તાહપ્રથમદિને પ્રત્યૂષે શ્મશાનાદુત્થાય
 યસ્યાઃ સપ્તભૂતાસ્ત્યાજિતાસ્તસ્યૈ મગ્દલીનીમરિયમે પ્રથમં દર્શનં દદૌ | 10
 તતઃ સા ગત્વા શોકરોદનકૃદ્ભ્યોડનુગતલોકેભ્યસ્તાં વાર્તા કથયામાસ | 11
 કિન્તુ યીશુઃ પુનર્જીવન્ તસ્યૈ દર્શનં દત્તવાનિતિ શ્રુત્વા તે ન પ્રત્યયન્ | 12
 પશ્ચાત્ તેષાં દ્વાયો ગ્રામયાનકાલે યીશુરન્યવેશં ધૃત્વા તાભ્યાં દર્શનં દદૌ!
 13 તાવપિ ગત્વાન્યશિષ્યેભ્યસ્તાં કથાં કથયાઞ્ચક્રતુઃ કિન્તુ તયોઃ કથામપિ
 તે ન પ્રત્યયન્ | 14 શેષત એકાદશશિષ્યેષુ ભોજનોપવિષ્ટેષુ યીશુસ્તેભ્યો

दर्शनं ददौ तथोत्थानात् परं तद्दर्शनप्राप्तलोकानां कथायामविश्वासकरणात्
तेषामविश्वासमनःकाठिन्याभ्यां हेतुभ्यां स तांस्तर्जितवान् | 15 अथ
तानायभ्यौ यूयं सर्व्वजगद् गत्वा सर्व्वजनान् प्रति सुसंवाहं प्रयारयत |
16 तत्र यः कश्चिद् विश्वस्य भज्जितो भवेत् स परित्रास्यते किन्तु यो न
विश्वसिष्यति स दण्डयिष्यते | 17 किञ्च ये प्रत्येभ्यन्ति तैरीदृग् आश्चर्य्यं
कर्म प्रकाशयिष्यते ते मन्नाम्ना भूतान् त्याजयिष्यन्ति भाषा अन्याश्च
वद्विष्यन्ति | 18 अपरं तैः सर्पेषु धृतेषु प्राणनाशकवस्तुनि पीते य तेषां
कापि क्षतिर्न भविष्यति; रोगिणां गात्रेषु करार्पिते तेऽरोगा भविष्यन्ति
य | 19 अथ प्रभुस्तानित्यादिश्य स्वर्गं नीतः सन् परमेश्वरस्य दक्षिण
उपविवेश | 20 ततस्ते प्रस्थाय सर्व्वत्र सुसंवादीयकथां प्रयारयितुमारेभिरे
प्रभुस्तु तेषां सहायः सन् प्रकाशिताश्चर्य्यक्रियाभिस्तां कथां प्रमाणावती
यकार | धृति |

ભૂક:

1 પ્રથમતો યે સાક્ષિણો વાક્યપ્રચારકાશ્રાસન્ તેડસ્માકં મધ્યે યદત્ સપ્રમાણં વાક્યમર્પયન્તિ સ્મ 2 તદનુસારતોડન્યેપિ બહવસ્તદ્વૃત્તાન્તં રચયિતું પ્રવૃત્તાઃ | 3 અતએવ હે મહામહિમથિયક્ષિલ્ ત્વં યા યાઃ કથા અશિક્ષ્યથાસ્તાસાં દૃઢપ્રમાણાનિ યથા પ્રાપ્નોષિ 4 તદર્થં પ્રથમમારભ્ય તાનિ સર્વાણિ જ્ઞાત્વાહમપિ અનુક્રમાત્ સર્વવૃત્તાન્તાન્ તુભ્યં લેખિતું મતિમકાર્ષમ્ | 5 યિહૂદાદેશીયહેરોદ્રામકે રાજત્વં કુર્વતિ અબીયયાજકસ્ય પર્યાયાધિકારી સિખરિયનામક એકો યાજકો હારોણવંશોદ્ભવા ઇલીશેવાખ્યા 6 તસ્ય જાયા દ્વાવિમૌ નિર્દોષૌ પ્રભોઃ સર્વાજ્ઞા વ્યવસ્થાશ્ચ સંમન્ય ઇશ્વરદૃષ્ટૌ ધાર્મિકાવાસ્તામ્ | 7 તયોઃ સન્તાન એકોપિ નાસીત્, યત ઇલીશેવા બન્ધ્યા તૌ દ્વાવેવ વૃદ્ધાવભવતામ્ | 8 યદા સ્વપર્યાનુક્રમેણ સિખરિય ઇશ્વાસ્ય સમક્ષં યાજકીયં કર્મ કરોતિ 9 તદા યજ્ઞસ્ય દિનપરિપાચ્યા પરમેશ્વરસ્ય મન્દિરે પ્રવેશકાલે ધૂપજ્વાલનં કર્મ તસ્ય કરણીયમાસીત્ | 10 તદ્ધૂપજ્વાલનકાલે લોકનિવહે પ્રાર્થનાં કર્તું બહિસ્તિષ્ઠતિ 11 સતિ સિખરિયો યસ્યાં વેદ્યાં ધૂપં જ્વાલયતિ તદ્દક્ષિણપાશ્વે પરમેશ્વરસ્ય દૂત એક ઉપસ્થિતો દર્શનં દદૌ | 12 તં દૃષ્ટ્વા સિખરિય ઉદ્ભિવિજે શશક્ટે ચ | 13 તદા સ દૂતસ્તં બભાષે હે સિખરિય મા ભૈસ્તવ પ્રાર્થના ગ્રાહ્યા જાતા તવ ભાર્યા ઇલીશેવા પુત્રં પ્રસોષ્યતે તસ્ય નામ યોહન્ ઇતિ કરિષ્યસિ | 14 કિંચ ત્વં સાનન્દઃ સહર્ષશ્ચ ભવિષ્યસિ તસ્ય જન્મનિ બહવ આનન્દિષ્યન્તિ ચ | 15 યતો હેતોઃ સ પરમેશ્વરસ્ય ગોચરે મહાન્ ભવિષ્યતિ તથા દ્રાક્ષારસં સુરાં વા કિમપિ ન પાસ્યતિ, અપરં જન્મારભ્ય પવિત્રેણાત્મના પરિપૂર્ણઃ 16 સન્ ઇસ્રાયેલ્વંશીયાન્ અનેકાન્ પ્રભોઃ પરમેશ્વરસ્ય માર્ગમાનેષ્યતિ | 17 સન્તાનાન્ પ્રતિ પિતૃણાં મનાંસિ ધર્મજ્ઞાનં પ્રત્યનાજ્ઞાગ્રાહિણશ્ચ પરાવર્તયિતું, પ્રભોઃ પરમેશ્વરસ્ય સેવાર્થમ્ એકાં સજ્જિતજાતિં વિધાતુઞ્ચ સ એલિયરૂપાત્મશક્તિપ્રાપ્તસ્તસ્યાગ્રે ગમિષ્યતિ | 18 તદા સિખરિયો દૂતભવાદીત્ કથમેતદ્ વેત્સ્યામિ? યતોહં વૃદ્ધો મમ ભાર્યા ચ વૃદ્ધા | 19 તતો દૂતઃ પ્રત્યુવાચ પશ્યેશ્વરસ્ય સાક્ષાદ્ધર્તી જિબ્રાયેલ્નામા દૂતોહં ત્વયા સહ કથાં ગદ્ધિતું તુભ્યમિમાં શુભવાર્તાં દાતુઞ્ચ પ્રેષિતઃ | 20 કિન્તુ મદીયં વાક્યં કાલે ફલિષ્યતિ તત્ ત્વયા ન પ્રતીતમ્ અતઃ કારણાદ્ યાવદેવ તાનિ ન સેત્સ્યન્તિ

તાવત્ ત્વં વક્તુમશક્તો મૂકો ભવ | 21 તદાનીં યે યે લોકાઃ સિખરિયમપૈક્ષન્ત
 તે મધ્યેમન્દિરં તસ્ય બહુવિલમ્બાદ્ આશ્ચર્ય્યં મેનિરે | 22 સ બહિરાગતો યદા
 કિમપિ વાક્યં વક્તુમશક્તઃ સક્રેતં કૃત્વા નિઃશબ્દસ્તસ્યૌ તદા મધ્યેમન્દિરં
 કસ્યચિદ્ દર્શનં તેન પ્રાપ્તમ્ ઇતિ સર્વ્યે બુબુધિરે | 23 અનન્તરં તસ્ય
 સેવનપર્યાયે સમ્પૂર્ણે સતિ સ નિજગેહં જગામ | 24 કતિપયદિનેષુ ગતેષુ
 તસ્ય ભાર્યા ઇલીશેવા ગર્ભવતી બભૂવ 25 પશ્ચાત્ સા પત્રમાસાન્
 સંગોપ્યાકથયત્ લોકાનાં સમક્ષં મમાપમાનં ખણ્ડયિતું પરમેશ્વરો મયિ
 દૃષ્ટિં પાતયિત્વા કર્મદૃશં કૃતવાન્ | 26 અપરઞ્ચ તસ્યા ગર્ભસ્ય ષષ્ઠે
 માસે જાતે ગાલીલ્પ્રદેશીયનાસરત્પુરે 27 દાયૂદો વંશીયાય યૂષ્કનામ્ને
 પુરુષાય યા મરિયમ્નામકુમારી વાગ્દતાસીત્ તસ્યાઃ સમીપં જિબ્રાયેલ્ દૂત
 ઇશ્વરેણ પ્રહિતઃ | 28 સ ગત્વા જગાદ હે ઇશ્વરાનુગૃહીતકન્યે તવ શુભં
 ભૂયાત્ પ્રભુઃ પરમેશ્વરસ્તવ સહાયોસ્તિ નારીણાં મધ્યે ત્વમેવ ધન્યા |
 29 તદાનીં સા તં દૃષ્ટ્વા તસ્ય વાક્યત ઉદ્વિજ્ય કીદૃશં ભાષણમિદમ્ ઇતિ
 મનસા ચિન્તયામાસ | 30 તતો દૂતોડવદત્ હે મરિયમ્ ભયં માકાર્ષીઃ, ત્વયિ
 પરમેશ્વરસ્યાનુગ્રહોસ્તિ | 31 પશ્ય ત્વં ગર્ભમ્ ધૃત્વા પુત્રં પ્રસોષ્યસે તસ્ય
 નામ યીશુરિતિ કરિષ્યસિ | 32 સ મહાન્ ભવિષ્યતિ તથા સર્વ્યેભ્યઃ શ્રેષ્ઠસ્ય
 પુત્ર ઇતિ ખ્યાસ્યતિ; અપરં પ્રભુઃ પરમેશ્વરસ્તસ્ય પિતુર્દાયૂદઃ સિંહાસનં
 તસ્મૈ દાસ્યતિ; 33 તથા સ યાકૂબો વંશોપરિ સર્વ્વદા રાજત્વં કરિષ્યતિ, તસ્ય
 રાજત્વસ્યાન્તો ન ભવિષ્યતિ | (aiṅg g165) 34 તદા મરિયમ્ તં દૂતં બભાષે
 નાહં પુરુષસઙ્ગં કરોમિ તર્હિ કથમેતત્ સમ્ભવિષ્યતિ? 35 તતો દૂતોડકથયત્
 પવિત્ર આત્મા ત્વામાશ્રાયિષ્યતિ તથા સર્વ્યશ્રેષ્ઠસ્ય શક્તિસ્તવોપરિ છાયાં
 કરિષ્યતિ તતો હેતોસ્તવ ગર્ભાદ્ યઃ પવિત્રબાલકો જનિષ્યતે સ ઇશ્વરપુત્ર
 ઇતિ ખ્યાતિં પ્રાપ્સ્યતિ | 36 અપરઞ્ચ પશ્ય તવ જ્ઞાતિરિલીશેવા યાં
 સર્વ્યે બન્ધ્યામવદન્ ઇદાનીં સા વાર્દ્ધક્યે સન્તાનમેકં ગર્ભેડધારયત્ તસ્ય
 ષષ્ઠમાસોભૂત્ | 37 કિમપિ કર્મ નાસાધ્યમ્ ઇશ્વરસ્ય | 38 તદા મરિયમ્
 જગાદ, પશ્ય પ્રભેરહં દાસી મહાં તવ વાક્યાનુસારેણ સર્વ્યમેતદ્ ઘટતામ્;
 અનનતરં દૂતસ્તસ્યાઃ સમીપાત્ પ્રતસ્થે | 39 અથ કતિપયદિનાત્ પરં
 મરિયમ્ તસ્માત્ પર્વતમયપ્રદેશીયચિહ્નદાયા નગરમેકં શીઘ્રં ગત્વા 40
 સિખરિયયાજકસ્ય ગૃહં પ્રવિશ્ય તસ્ય જાયામ્ ઇલીશેવાં સમ્બોધ્યાવદત્ |

41 તતો મરિયમઃ સમ્બોધનવાક્યે ઇલીશેવાયાઃ કર્ણયોઃ પ્રવિષ્ટમાત્રે સતિ
 તસ્યા ગર્ભસ્થબાલકો નનર્ત્ત | તત ઇલીશેવા પવિત્રેણાત્મના પરિપૂર્ણા
 સતી 42 પ્રોચ્યૈર્ગદ્ધિતુમારેભે, યોષિતાં મધ્યે ત્વમેવ ધન્યા, તવ ગર્ભસ્થઃ
 શિશુશ્ચ ધન્યઃ | 43 ત્વં પ્રભોર્માતા, મમ નિવેશને ત્વયા ચરણાવર્ષિતૌ,
 મમાધ સૌભાગ્યમેતત્ | 44 પશ્ય તવ વાક્યે મમ કર્ણયોઃ પ્રવિષ્ટમાત્રે સતિ
 મમોદરસ્થઃ શિશુરાનન્દાન્ નનર્ત્ત | 45 યા સ્ત્રી વ્યશ્વસીત્ સા ધન્યા, યતો
 હેતોસ્તાં પ્રતિ પરમેશ્વરોક્તં વાક્યં સર્વ્યં સિદ્ધં ભવિષ્યતિ | 46 તદાનીં
 મરિયમ્ જગાદ | ધન્યવાદં પરેશસ્ય કરોતિ મામકં મનઃ | 47 મમાત્મા
 તારકેશે ચ સમુલ્લાસં પ્રગચ્છતિ | 48 અકરોત્ સ પ્રભુ દૃષ્ટિં સ્વદાસ્યા
 દુર્ગતિં પ્રતિ | પશ્યાધારભ્ય માં ધન્યાં વક્ષ્યન્તિ પુરુષાઃ સદા | 49 યઃ
 સર્વ્યશક્તિમાન્ યસ્ય નામાપિ ચ પવિત્રકં | સ એવ સુમહત્કર્મ કૃતવાન્
 મન્નિમિત્તકં | 50 યે ભિભ્યતિ જનાસ્તસ્માત્ તેષાં સન્તાનપંક્તિષુ | અનુકમ્પા
 તદીયા ચ સર્વ્યદૈવ સુતિષ્ઠતિ | 51 સ્વબાહુબલતસ્તેન પ્રાકાશ્યત પરાક્રમઃ |
 મનઃકુમન્ત્રણાસાર્દ્ધં વિકીર્યન્તેઽભિમાનિનઃ | 52 સિંહાસનગતાલ્લોકાન્
 બલિનશ્રાવરોહ્ય સઃ | પદેષૂચ્યેષુ લોકાંસ્તુ ક્ષુદ્રાન્ સંસ્થાપયત્યપિ | 53
 ક્ષુધિતાન્ માનવાન્ દ્રવ્યૈરુત્તમૈઃ પરિતર્થ્ય સઃ | સકલાન્ ધનિનો લોકાન્
 વિસૃજેદ્ રિક્તહસ્તકાન્ | 54 ઇબ્રાહીમિ ચ તદ્વંશે યા દયાસ્તિ સદૈવ
 તાં | સ્મૃત્વા પુરા પિતૃણાં નો યથા સાક્ષાત્ પ્રતિશ્રુતં | (aiōn g165) 55
 ઇસ્રાયેલ્સેવકસ્તેન તથોપક્રિયતે સ્વયં | | 56 અનન્તરં મરિયમ્ પ્રાયેણ
 માસત્રયમ્ ઇલીશેવયા સહોષિત્વા વ્યાધુચ્ય નિજનિવેશનં યયૌ | 57
 તદનન્તરમ્ ઇલીશેવાયાઃ પ્રસવકાલ ઉપસ્થિતે સતિ સા પુત્રં પ્રાસોષ્ટ | 58
 તતઃ પરમેશ્વરસ્તસ્યાં મહાનુગ્રહં કૃતવાન્ એતત્ શ્રુત્વા સમીપવાસિનઃ
 કુટુમ્બાશ્રાગત્ય તયા સહ મુમુદિરે | 59 તથાષ્ટમે દિને તે બાલકસ્ય ત્વયં
 છેત્તુમ્ એત્ય તસ્ય પિતૃનામાનુરૂપં તન્નામ સિખરિય ઇતિ કર્તુમીષુઃ | 60 કિન્તુ
 તસ્ય માતાકથયત્ તન્ન, નામાસ્ય યોહન્ ઇતિ કર્તવ્યમ્ | 61 તદા તે વ્યાહરન્
 તવ વંશમધ્યે નામેદૃશં કસ્યાપિ નાસ્તિ | 62 તતઃ પરં તસ્ય પિતરં સિખરિયં
 પ્રતિ સક્રુત્ય પપ્રચ્છુઃ શિશોઃ કિં નામ કારિષ્યતે? 63 તતઃ સ ફલકમેકં
 યાચિત્વા લિલેખ તસ્ય નામ યોહન્ ભવિષ્યતિ | તસ્માત્ સર્વ્યે આશ્ચર્ય
 મેનિરે | 64 તત્ક્ષણં સિખરિયસ્ય જિહ્વાજાડયેડપગતે સ મુખં વ્યાદાય

સ્પષ્ટવાર્ણમુખ્યાર્ચ્ય ઈશ્વરસ્ય ગુણાનુવાદં ચકાર | 65 તસ્માચ્યતુર્દિક્સ્થાઃ
 સમીપવાસિલોકા ભીતા એવમેતાઃ સર્વાઃ કથા યિહૂદાયાઃ પર્વતમયપ્રદેશસ્ય
 સર્વત્ર પ્રચારિતાઃ | 66 તસ્માત્ શ્રોતારો મનઃસુ સ્થાપયિત્વા કથયામ્બભૂવુઃ
 કીદૃશોયં બાલો ભવિષ્યતિ? અથ પરમેશ્વરસ્તસ્ય સહાયોભૂત્ | 67
 તદા યોહનઃ પિતા સિખરિયઃ પવિત્રેણાત્મના પરિપૂર્ણઃ સન્ એતાદૃશં
 ભવિષ્યદ્વાક્યં કથયામાસ | 68 ઇસ્રાયેલઃ પ્રભુ ર્યસ્તુ સ ધન્યઃ પરમેશ્વરઃ |
 અનુગૃહ્ય નિજાલ્લોકાન્ સ એવ પરિમોચયેત્ | 69 વિપક્ષજનહસ્તેભ્યો યથા
 મોચ્યામહે વયં | યાવજજીવન્ન ધર્મોણ સારલ્યેન ચ નિર્ભયાઃ | 70 સેવામહે
 તમેવૈકમ્ એતત્કારણમેવ ચ | સ્વકીયં સુપવિત્રન્ન સંસ્મૃત્ય નિયમં સદા | 71
 કૃપયા પુરુષાન્ પૂર્વાન્ નિકષાર્થાત્તુ નઃ પિતુઃ | ઇબ્રાહીમઃ સમીપે યં શપથં
 કૃતવાન્ પુરા | 72 તમેવ સફલં કર્ત્ત તથા શત્રુગણસ્ય ચ | ઋતીયાકારિણશ્રૈવ
 કરેભ્યો રક્ષણાય નઃ | 73 સૃષ્ટેઃ પ્રથમતઃ સ્વીયૈઃ પવિત્રૈ ભાવિવાદિભિઃ |
 (aiōn g165) 74 યથોક્તવાન્ તથા સ્વસ્ય દાયૂદઃ સેવકસ્ય તુ | 75 વંશે
 ત્રાતારમેકં સ સમુત્પાદિતવાન્ સ્વયમ્ | 76 અતો હે બાલક ત્વન્તુ સર્વેભ્યઃ
 શ્રેષ્ઠ એવ યઃ | તસ્યૈવ ભાવિવાદીતિ પ્રવિખ્યાતો ભવિષ્યસિ | અસ્માકં
 ચરણાન્ ક્ષેમે માર્ગે ચાલયિતું સદા | એવં ધ્યાન્તેઽર્થતો મૃત્યોશ્છાયાયાં યે તુ
 માનવાઃ | 77 ઉપવિષ્ટાસ્તુ તાનેવ પ્રકાશયિતુમેવ હિ | કૃત્વા મહાનુકમ્પાં હિ
 યામેવ પરમેશ્વરઃ | 78 ઊર્દ્ધ્વાત્ સૂર્યમુદાયૈવાસ્મભ્યં પ્રાદાતુ દર્શનં |
 તયાનુકમ્પયા સ્વસ્ય લોકાનાં પાપમોચને | 79 પરિત્રાણસ્ય તેભ્યો હિ
 જ્ઞાનવિશ્રાણનાય ચ | પ્રભો માર્ગં પરિષ્કર્તું તસ્યાગ્રાથી ભવિષ્યસિ | | 80
 અથ બાલકઃ શરીરેણ બુદ્ધ્યા ચ વર્દ્ધિતુમારેભે; અપરન્ન સ ઇસ્રાયેલો
 વંશીયલોકાનાં સમીપે યાવન્ન પ્રકટીભૂતસ્તાસ્તાવત્ પ્રાન્તરે ન્યવસત્ |

2 અપરન્ન તસ્મિન્ કાલે રાજ્યસ્ય સર્વેષાં લોકાનાં નામાનિ લેખયિતુમ્
 અગસ્તકૈસર આજ્ઞાપયામાસ | 2 તદનુસારેણ કુરીણિયનામનિ સુરિયાદેશસ્ય
 શાસકે સતિ નામલેખનં પ્રારેભે | 3 અતો હેતો નામ લેખિતું સર્વે જનાઃ
 સ્વીયં સ્વીયં નગરં જગ્મુઃ | 4 તદાનીં યૂષક્ષ્ નામ લેખિતું વાગ્દત્તયા
 સ્વભાર્યયા ગર્ભવત્યા મરિયમા સહ સ્વયં દાયૂદઃ સજાતિવંશ ઇતિ
 કારણાઠ્ ગાલીલપ્રદેશસ્ય નાસરત્નગરાઠ્ 5 યિહૂદાપ્રદેશસ્ય બૈત્લેહમાખ્યં
 દાયૂદ્ગરં જગામ | 6 અન્યચ તત્ર સ્થાને તયોસ્તિષ્ઠતોઃ સતો મરિયમઃ

પ્રસૂતિકાલ ઉપસ્થિતે 7 સા તં પ્રથમસુતં પ્રાસોષ્ટ કિન્તુ તસ્મિન્ વાસગૃહે
 સ્થાનાભાવાદ્ બાલકં વસ્ત્રેણ વેષ્ટયિત્વા ગોશાલાયાં સ્થાપયામાસ |
 8 અનન્તરં યે કિયન્તો મેષપાલકાઃ સ્વમેષવ્રજરક્ષાયૈ તત્પ્રદેશે સ્થિત્વા
 રજન્યાં પ્રાન્તરે પ્રહરિણઃ કર્મ કુર્વન્તિ, 9 તેષાં સમીપં પરમેશ્વરસ્ય દૂત
 આગત્યોપતસ્થૌ; તદા ચતુષ્પાશર્વે પરમેશ્વરસ્ય તેજસઃ પ્રકાશિતત્વાત્
 તેડતિશશક્ટિરે | 10 તદા સ દૂત ઉવાચ મા ભૈષ્ટ પશ્યતાધ દાયૂદઃ પુરે
 યુષ્મન્નિમિત્તં ત્રાતા પ્રભુઃ પ્રીષ્ટોડજનિષ્ટ, 11 સર્વેષાં લોકાનાં મહાનન્દજનકમ્
 ઇમં મજ્જલવૃતાન્તં યુષ્માન્ જ્ઞાપયામિ | 12 યૂયં (તત્સ્થાનં ગત્વા) વસ્ત્રવેષ્ટિતં
 તં બાલકં ગોશાલાયાં શયનં દ્રક્ષ્યથ યુષ્માન્ પ્રતીદં ચિહ્નં ભવિષ્યતિ | 13
 દૂત ઇમાં કથાં કથિતવતિ તત્રાકસ્માત્ સ્વર્ગીયાઃ પૃતના આગત્ય કથામ્
 ઇમાં કથયિત્વેશ્વરસ્ય ગુણાનન્વવાદિષુઃ, યથા, 14 સર્વોદ્વિવસ્થૈરીશ્વરસ્ય
 મહિમા સમ્પ્રકાશ્યતાં | શાન્તિર્ભૂયાત્ પૃથિવ્યાસ્તુ સન્તોષશ્ચ નરાન્ પ્રતિ | |
 15 તતઃ પરં તેષાં સન્નિધે દૂતગણે સ્વર્ગં ગતે મેષપાલકાઃ પરસ્પરમ્ અવેચન્
 આગચ્છત પ્રભુઃ પરમેશ્વરો યાં ઘટનાં જ્ઞાપિતવાન્ તસ્યા યાથર્થ જ્ઞાતું
 વચમધુના ભૈત્લેહમ્પુરં યામઃ | 16 પશ્ચાત્ તે તૂર્ણાં વ્રજિત્વા મરિચમં યૂષ્કં
 ગોશાલાયાં શયનં બાલકઞ્ચ દદૃશુઃ | 17 ઇત્યં દૃષ્ટ્વા બાલકસ્યાર્થે પ્રોકતાં
 સર્વકથાં તે પ્રાચારયાઞ્ચક્રુઃ | 18 તતો યે લોકા મેષરક્ષકાણાં વદનેભ્યસ્તાં
 વાર્તાં શુશ્રુવુસ્તે મહાશ્ચર્યં મેનિરે | 19 કિન્તુ મરિચમ્ એતત્સર્વઘટનાનાં
 તાત્પર્યં વિવિચ્ય મનસિ સ્થાપયામાસ | 20 તત્પશ્ચાદ્ દૂતવિજ્ઞાપ્તાનુરૂપં
 શ્રુત્વા દૃષ્ટ્વા ચ મેષપાલકા ઈશ્વરસ્ય ગુણાનુવાદં ધન્યવાદઞ્ચ કુર્વાણાઃ
 પરાવૃત્ય યયુઃ | 21 અથ બાલકસ્ય ત્વક્ષેદનકાલેડષ્ટમદિવસે સમુપસ્થિતે
 તસ્ય ગર્ભસ્થિતેઃ પુર્વં સ્વર્ગીયદૂતો યથાજ્ઞાપયત્ તદનુરૂપં તે તન્નામધેયં
 યીશુરિતિ ચક્રિરે | 22 તતઃ પરં મૂસાલિખિતવ્યવસ્થાયા અનુસારેણ
 મરિચમઃ શુચિત્વકાલ ઉપસ્થિતે, 23 "પ્રથમજઃ સર્વઃ પુરુષસન્તાનઃ
 પરમેશ્વરે સમર્પ્યતાં," ઇતિ પરમેશ્વરસ્ય વ્યવસ્થયા 24 યીશું પરમેશ્વરે
 સમર્પયિતુમ્ શાસ્ત્રીયવિધ્યુક્તં કપોતદ્વયં પારાવતશાવકદ્વયં વા બલિં દાતું તે
 તં ગૃહીત્વા ચિરૂશાલમમ્ આચયુઃ | 25 ચિરૂશાલમ્પુરનિવાસી શિમિયોન્નામા
 ધાર્મિક એક આસીત્ સ ઇસ્રાયેલઃ સાન્તવનામપેક્ષ્ય તસ્થૌ કિઞ્ચ પવિત્ર
 આત્મા તસ્મિન્નાવિર્ભૂતઃ | 26 અપરં પ્રભુણા પરમેશ્વરેણાભિષિક્તે

त्रातरि त्वया न दृष्टे त्वं न मरिष्यसीति वाक्यं पवित्रेण आत्मना तस्म
 प्राकथ्यत। 27 अपरञ्च यदा यीशोः पिता माता य तदर्थं व्यवस्थानुत्तुपं
 कर्म्म कर्तुं तं मन्दिरेम् आनिन्यतुस्तदा 28 शिमियोन् आत्मन आकर्षणेन
 मन्दिरेमागत्य तं क्रोडे निधाय ईश्वरस्य धन्यवादे कृत्वा कथयामास,
 यथा, 29 हे प्रभो तव दासोयं निजवाक्यानुसारतः। एदानीन्तु सकल्याणो
 भवता संविसृज्यताम्। 30 यतः सकलदेशस्य दीप्तये दीप्तिरूपकं। 31
 एसायेलीयलोकस्य मडागौरवरूपकं। 32 यं त्रायकं जनानान्तु सम्भुभे
 त्वमञ्जुजनः। सअेव विधतेऽस्माकं ध्रवं नयननगोचरे। 33 तदानीं
 तेनोक्ता अेताः सकलाः कथाः श्रुत्वा तस्य माता यूषङ् य विस्मयं मेनाते। 34
 ततः परं शिमियोन् तेभ्य आशिषं दत्त्वा तन्मातरं मरियमम् उवाच, पश्य
 एसायेलो वंशमध्ये बहूनां पातनायोत्थापनाय य तथा विरोधपात्रं भवितुं,
 बहूनां गुप्तमनोगतानां प्रकटीकरणाय बालकोयं नियुक्तोस्ति। 35 तस्मात्
 तवापि प्राणाः शूलेन व्यत्स्यन्ते। 36 अपरञ्च आशेरस्य वंशीयङ्गिनूयेलो
 दुहितेना उन्नाप्या अतिजरती भविष्यद्वादिन्येका या विवाहात् परं सप्त
 वत्सरान् पत्या सह न्यवसत् ततो विधवा भूत्वा यतुरशीतिवर्षवयःपर्यन्तं
 37 मन्दिरे स्थित्वा प्रार्थनोपवासैर्दिवानिशम् ईश्वरम् असेवत सापि
 स्त्री तस्मिन् समये मन्दिरेमागत्य 38 परमेश्वरस्य धन्यवादे यकार,
 यिज्ञासालम्पुरवासिनो यावन्तो लोका मुक्तिमपेक्ष्य स्थितास्तान् यीशोर्वृत्तान्तं
 ज्ञापयामास। 39 एतं परमेश्वरस्य व्यवस्थानुसारेण सर्वेषु कर्म्मसु कृतेषु
 तौ पुनश्च गालीलौ नासरत्नामकं निजनगरं प्रतस्थाते। 40 तत्पश्चाद् बालकः
 शरीरेण वृद्धिमेत्य ज्ञानेन परिपूर्णा आत्मना शक्तिमांश्च भवितुमारेभे
 तथा तस्मिन् ईश्वरानुग्रहो बभूव। 41 तस्य पिता माता य प्रतिवर्षं
 निस्तारोत्सवसमये यिज्ञासालमम् अगच्छताम्। 42 अपरञ्च यीशौ
 द्वादशवर्षवयस्के सति तौ पर्वसमयस्य रीत्यनुसारेण यिज्ञासालमं गत्वा 43
 पार्व्यां सम्पाद्य पुनरपि व्याघुय्य यातः किन्तु यीशुर्बालको यिज्ञासालमि
 तिष्ठति। यूषङ् तन्माता य तद् अविदित्वा 44 स सङ्गिभिः सह विधत
 अेतय्य बुद्ध्या दिनेकगम्यमार्गं जगमतुः। किन्तु शेषे ज्ञातिबन्धूनां समीपे
 भृगयित्वा तद्दुद्देशमप्राप्य 45 तौ पुनरपि यिज्ञासालमम् परापृत्यागत्य तं
 भृगयाञ्चक्रतुः। 46 अथ दिनत्रयात् परं परिडितानां मध्ये तेषां कथाः शृण्वन्

तत्त्वं पृच्छंश्च मन्दिरे समुपविष्टः स ताभ्यां दृष्टः | 47 तदा तस्य भुङ्क्ष्या
 प्रत्युत्तरैश्च सर्व्वे श्रोतारो विस्मयमापधन्ते | 48 तादृशं दृष्ट्वा तस्य जनको
 जननी य यमय्यङ्कतुः किञ्च तस्य माता तमवदत्, हे पुत्र, कथमावां प्रतीत्यं
 समाचरस्त्वम्? पश्य तव पिताहञ्च शोकाकुलौ सन्तौ त्वामन्विच्छावः
 स्म | 49 ततः सोवदत् कुतो माम् अन्वैच्छतं? पितुर्गृहे मया स्थातव्यम्
 अेतत् किं युवाभ्यां न ज्ञायते? 50 किन्तु तौ तस्यैतद्वाक्यस्य तात्पर्य्यं बोद्धुं
 नाशक्नुतां | 51 ततः परं स ताभ्यां सह नासरतं गत्वा तयोर्वशीभूतस्तस्थौ
 किन्तु सर्व्वा अेताः कथास्तस्य माता मनसि स्थापयामास | 52 अथ
 यीशोर्बुद्धिः शरीरञ्च तथा तस्मिन् ईश्वरस्य मानवानाञ्चानुग्रहो वर्द्धितुम्
 आरेभे |

3 अनन्तरं तिब्बिरियकैसरस्य राजत्वस्य पञ्चदशे वत्सरे सति यदा
 पन्तीयपीलातो यिडूदादेशाधिपति र्हेरोद् तु गालीलप्रदेशस्य राजा
 झिलिपनामा तस्य भ्राता तु यितूरियायास्त्राफोनीतियाप्रदेशस्य य
 राजासीत् लुषानीयनामा अविलीनीदेशस्य राजासीत् 2 डानन् कियझुश्रैमौ
 प्रधानयाजाकावास्तां तदानीं सिभरियस्य पुत्राय योडने मध्येप्रान्तरम्
 ईश्वरस्य वाक्ये प्रकाशिते सति 3 स यर्दन उभयतटप्रदेशान् समेत्य
 पापमोयनार्थं मनःपरावर्त्तनस्य यिहूइपं यन्मज्जनं तदीयाः कथाः सर्व्वत्र
 प्रचारयितुमारभे | 4 यिशयियमविष्यद्वक्तृग्रन्थे यादृशी लिपिरास्ते
 यथा, परमेशस्य पन्थानं परिष्कुरुत सर्व्वतः | तस्य राजपथञ्चैव समानं
 कुरुताधुना | 5 कारिष्यन्ते समुच्छ्रायाः सकला निम्नभूमयः | कारिष्यन्ते
 नताः सर्व्वे पर्व्वताश्चोपपर्व्वताः | कारिष्यन्ते य या वकास्ताः सर्व्वाः सरला
 भुवः | कारिष्यन्ते समानास्ता या उच्यनीयभूमयः | 6 ईश्वरेण कृतं
 त्राणं द्रक्ष्यन्ति सर्व्वमानवाः | एत्येतत् प्रान्तरे वाक्यं वदतः कस्यचिद्
 रवः | | 7 ये ये लोका मज्जनार्थं बहिराययुस्तान् सोवदत् रे रे सर्पवंशा
 आगामिनः कोपात् पलायितुं युष्मान् कश्चेतयामास? 8 तस्माद् एब्राहीम्
 अस्माकं पिता कथामीदृशीं मनोभिर्न कथयित्वा यूयं मनःपरिवर्त्तनयोग्यं
 इलं इलत; युष्मानलं यथार्थं वदामि पाषाणोभ्य अेतोभ्य ईश्वर एब्राहीमः
 सन्तानोत्पादने समर्थः | 9 अपरञ्च तरुमूलेऽधुनापि परशुः संलग्नोस्ति
 यस्तरुस्तमं इलं न इलति स छिधतेऽग्नौ निक्षिप्यते य | 10 तदानीं

લોકાસ્તં પપ્રચ્છુસ્તર્હિ કિં કર્તવ્યમસ્માભિઃ? 11 તતઃ સોવાદીત્ યસ્ય દ્વે
 વસને વિધેતે સ વસ્ત્રહીનાયૈકં વિતરતુ કિંચ યસ્ય ખાધદ્રવ્યં વિધેતે સોપિ
 તથૈવ કરોતુ | 12 તતઃ પરં કરસત્રાચિનો મજ્જનાર્થમ્ આગત્ય પપ્રચ્છુઃ હે
 ગુરો કિં કર્તવ્યમસ્માભિઃ? 13 તતઃ સોકથયત્ નિરૂપિતાદધિકં ન ગૃહ્ણિત | 14
 અનન્તરં સેનાગણ એત્ય પપ્રચ્છ કિમસ્માભિ વા કર્તવ્યમ્? તતઃ સોભિદધે
 કસ્ય કામપિ હાનિં મા કાર્ષ્ઠ તથા મૃષાપવાદં મા કુરુત નિજવેતનેન ચ
 સન્તુષ્ય તિષ્ઠત | 15 અપરઞ્ચ લોકા અપેક્ષયા સ્થિત્વા સર્વોપીતિ મનોભિ
 વિતર્કયાઞ્ચક્રુઃ, યોહનયમ્ અભિષિક્તસ્ત્રાતા ન વેતિ? 16 તદા યોહન્ સર્વાન્
 વ્યાજહાર, જલેડહં યુષ્માન્ મજ્જયામિ સત્યં કિન્તુ યસ્ય પાદુકાબન્ધનં
 મોચયિતુમપિ ન યોગ્યોસ્મિ તાદૃશ એકો મત્તો ગુરુતરઃ પુમાન્ એતિ, સ
 યુષ્માન્ વહ્નિરૂપે પવિત્ર આત્મનિ મજ્જયિષ્યતિ | 17 અપરઞ્ચ તસ્ય હસ્તે
 શૂર્પ આસ્તે સ સ્વશસ્યાનિ શુદ્ધરૂપં પ્રસ્ફોટ્ય ગોધૂમાન્ સર્વાન્ ભાણ્ડાગારે
 સંગ્રહીષ્યતિ કિન્તુ બૂષાણિ સર્વાણ્યનિર્વાણવહ્નિના દાહયિષ્યતિ | 18
 યોહન્ ઉપદેશેનેત્યં નાનાકથા લોકાનાં સમક્ષં પ્રચારયામાસ | 19 અપરઞ્ચ
 હેરોદ્ રાજા ક્ષિલ્ખામ્નઃ સહોદરસ્ય ભાર્ય્યા હેરોદિયામધિ તથાન્યાનિ
 યાનિ યાનિ કુકર્માણિ કૃતવાન્ તદધિ ચ 20 યોહના તિરસ્કૃતો ભૂત્વા
 કારાગારે તસ્ય બન્ધનાદ્ અપરમપિ કુકર્મ ચકાર | 21 ઇતઃ પૂર્વં યસ્મિન્
 સમયે સર્વો યોહના મજ્જિતાસ્તદાનીં યીશુરખ્યાગત્ય મજ્જિતઃ | 22
 તદનન્તરં તેન પ્રાર્થિતે મેઘદ્વારં મુક્તં તસ્માચ્ચ પવિત્ર આત્મા મૂર્તિમાન્ ભૂત્વા
 કપોતવત્ તદુપચ્ચવરુરોહ; તદા ત્વં મમ પ્રિયઃ પુત્રસ્ત્વયિ મમ પરમઃ સન્તોષ
 ઇત્યાકાશવાણી બભૂવ | 23 તદાનીં યીશુઃ પ્રાયેણ ત્રિંશદ્વર્ષવયસ્ક આસીત્ |
 લૌકિકજ્ઞાને તુ સ યૂષ્ઠ્ઃ પુત્રઃ, 24 યૂષ્ઠ્ઃ એલેઃ પુત્રઃ, એલિર્મત્તતઃ પુત્રઃ,
 મત્તત્ લેવેઃ પુત્રઃ, લેવિર્મલ્કેઃ પુત્રઃ, મલ્કિર્યાન્નસ્ય પુત્રઃ; યાન્નો યૂષ્ઠ્ઃ પુત્રઃ |
 25 યૂષ્ઠ્ઃ મત્તથિયસ્ય પુત્રઃ, મત્તથિય આમોસઃ પુત્રઃ, આમોસ્ નહૂમઃ પુત્રઃ,
 નહૂમ્ ઇષ્લેઃ પુત્રઃ ઇષ્લિર્નગેઃ પુત્રઃ | 26 નગિર્માટઃ પુત્રઃ, માટ્ મત્તથિયસ્ય
 પુત્રઃ, મત્તથિયઃ શિમિયેઃ પુત્રઃ, શિમિયિર્યૂષ્ઠ્ઃ પુત્રઃ, યૂષ્ઠ્ઃ યિહૂદાઃ પુત્રઃ |
 27 યિહૂદા યોહાનાઃ પુત્રઃ, યોહાના રીષાઃ પુત્રઃ, રીષાઃ સિરુબ્બાબિલઃ પુત્રઃ,
 સિરુબ્બાબિલ્ શલ્તીયેલઃ પુત્રઃ, શલ્તીયેલ્ નેરેઃ પુત્રઃ | 28 નેરિર્મલ્કેઃ પુત્રઃ,
 મલ્કિઃ અધઃ પુત્રઃ, અદી કોષમઃ પુત્રઃ, કોષમ્ ઇલ્મોદદઃ પુત્રઃ, ઇલ્મોદદ્

એર: પુત્ર: | 29 એર્ યોશે: પુત્ર:, યોશિ: ઇલીયેષર: પુત્ર:, ઇલીયેષર્
યોરીમ: પુત્ર:, યોરીમ્ મત્તત: પુત્ર:, મત્તત લેવે: પુત્ર: | 30 લેવિ: શિમિયોન:
પુત્ર:, શિમિયોન્ ચિહૂદા: પુત્ર:, ચિહૂદા યૂષુફ: પુત્ર:, યૂષુફ્ યોનન: પુત્ર:,
યાનન્ ઇલીયાકીમ: પુત્ર: | 31 ઇલિયાકીમ્: મિલેયા: પુત્ર:, મિલેયા મૈનન:
પુત્ર:, મૈનન્ મત્તતસ્ય પુત્ર:, મત્તતો નાથન: પુત્ર:, નાથન્ દાયૂદ: પુત્ર: | 32
દાયૂદ્ યિશય: પુત્ર:, યિશય ઓબેદ: પુત્ર, ઓબેદ્ બોયસ: પુત્ર:, બોયસ્
સલ્મોન: પુત્ર:, સલ્મોન્ નહ્શોન: પુત્ર: | 33 નહ્શોન્ અમ્મીનાદબ: પુત્ર:,
અમ્મીનાદબ્ અરામ: પુત્ર:, અરામ્ હિપ્રોણ: પુત્ર:, હિપ્રોણ્ પેરસ: પુત્ર:,
પેરસ્ ચિહૂદા: પુત્ર: | 34 ચિહૂદા યાફૂબ: પુત્ર:, યાફૂબ્ ઇસ્હાક: પુત્ર:, ઇસ્હાક્
ઇબ્રાહીમ: પુત્ર:, ઇબ્રાહીમ્ તેરહ: પુત્ર:, તેરહ્ નાહોર: પુત્ર: | 35 નાહોર્
સિરુગ: પુત્ર:, સિરુગ્ રિવ્વ: પુત્ર:, રિવૂ: પેલગ: પુત્ર:, પેલગ્ એવર: પુત્ર:,
એવર્ શેલહ: પુત્ર: | 36 શેલહ્ કૈનન: પુત્ર:, કૈનન્ અર્ફક્ષદ: પુત્ર:, અર્ફક્ષદ્
શામ: પુત્ર:, શામ્ નોહ: પુત્ર:, નોહો લેમક: પુત્ર: | 37 લેમક્ મિથૂશેલહ:
પુત્ર:, મિથૂશેલહ્ હનોક: પુત્ર:, હનોક્ ચેરદ: પુત્ર:, ચેરદ્ મહલલેલ: પુત્ર:,
મહલલેલ્ કૈનન: પુત્ર: | 38 કૈનન્ ઇનોશ: પુત્ર:, ઇનોશ્ શેત: પુત્ર:, શેત્
આદમ: પુત્ર, આદમ્ ઇશ્વરસ્ય પુત્ર: |

4 તત: પરં યીશુ: પવિત્રેણાત્મના પૂર્ણ: સન્ યર્દનનદ્યા: પરાવૃત્યાત્મના
પ્રાન્તરં નીત: સન્ ચત્વારિંશદિનાનિ યાવત્ શૈતાના પરીક્ષિતોઽભૂત્, 2 કિઞ્ચ
તાનિ સર્વ્વદિનાનિ ભોજનં વિના સ્થિતત્વાત્ કાલે પૂર્ણે સ ક્ષુધિતવાન્ | 3
તત: શૈતાનાગત્ય તમવદત્ ત્વં ચેદીશ્વરસ્ય પુત્રસ્તર્હિ પ્રસ્તરાનેતાન્ આજ્ઞયા
પૂપાન્ કુરુ | 4 તદા યીશુરુવાચ, લિપિરીદૃશી વિધતે મનુજ: કેવલેન
પૂપેન ન જીવતિ કિન્ત્વીશ્વરસ્ય સર્વ્વાભિરાજ્ઞાભિ જીવતિ | 5 તદા શૈતાન્
તમુચ્યં પર્વતં નીત્વા નિમિષૈકમધ્યે જગત: સર્વ્વરાજ્યાનિ દર્શિતવાન્ | 6
પશ્ચાત્ તમવાદીત્ સર્વ્વમ્ એતદ્ વિભવં પ્રતાપઞ્ચ તુભ્યં દાસ્યામિ તન્ મયિ
સમર્પિતમાસ્તે યં પ્રતિ મમેચ્છા જાયતે તસ્મૈ દાતું શક્નોમિ, 7 ત્વં ચેન્માં
ભજસે તર્હિ સર્વ્વમેતત્ તવૈવ ભવિષ્યતિ | 8 તદા યીશુસ્તં પ્રત્યુક્તવાન્
દૂરી ભવ શૈતાન્ લિપિરાસ્તે, નિજં પ્રભું પરમેશ્વરં ભજસ્વ કેવલં તમેવ
સેવસ્વ ચ | 9 અથ શૈતાન્ તં ચિરૂશાલમં નીત્વા મન્દિરસ્ય ચૂડાયા ઉપરિ
સમુપવેશ્ય જગાદ ત્વં ચેદીશ્વરસ્ય પુત્રસ્તર્હિ સ્થાનાદિતો લખ્કિત્વાધ: 10

पत यतो लिपिरास्ते, आज्ञापयिष्यति स्वीयान् दूतान् स परमेश्वरः | 11
 रक्षितुं सर्वमार्गो त्वां तेन त्वय्यराणो यथा | न लगेत् प्रस्तराघातस्त्वां
 धरिष्यन्ति ते तथा | 12 तदा यीशुना प्रत्युक्तम् एदमध्युक्तमस्ति त्वं
 स्वप्रभुं परेशं मा परीक्षस्व | 13 पश्चात् शैतान् सर्वपरीक्षां समाप्य
 क्षाणत्तं त्यक्त्वा ययौ | 14 तदा यीशुरात्मप्रभावात् पुनर्गालीलप्रदेशं
 गतस्तदा तत्सुभ्यातिश्रुतिर्दिशं व्यानशे | 15 स तेषां भजनगृहेषु उपदिश्य
 सर्वैः प्रशंसितो बभूव | 16 अथ स स्वपालनस्थानं नासरत्पुरमेत्य
 विश्रामवारे स्वाचाराद् भजनगेदं प्रविश्य पठितुमुत्तस्थौ | 17 ततो
 यिशयियभविष्यद्वादिनः पुस्तके तस्य करदत्ते सति स तत् पुस्तकं विस्तार्थं
 यत्र वक्ष्यमाणानि वयनानि सन्ति तत् स्थानं प्राप्य पपाठ | 18 आत्मा तु
 परमेशस्य मदीयोपरि विधत्ते | दरिद्रेषु सुसंवादे वक्तुं मां सोभिषिक्तवान् |
 भग्नान्तः करणाल्लोकान् सुस्वस्थान् कर्तुमेव य | बन्दीकृतेषु लोकेषु मुक्ते
 र्धोषयितुं वयः | नेत्राणि दातुमन्धेभ्यस्त्रातुं बद्धजनानपि | 19 परेशानुग्रहे
 कालं प्रचारयितुमेव य | सर्वैतत्करणार्थाय मामेव प्रदिशोति सः | | 20
 ततः पुस्तकं बह्व्या परियारकस्य इस्ते समर्थ यासने समुपविष्टः, ततो
 भजनगृहे यावन्तो लोका आसन् ते सर्वेऽनन्यदृष्ट्या तं विलुलोकिरे | 21
 अनन्तरम् अथैतानि सर्वाणि लिपितवयनानि युष्माकं मध्ये सिद्धानि स
 एमां कथां तेभ्यः कथयितुमारेभे | 22 ततः सर्वे तस्मिन् अन्वरज्यन्त,
 किञ्च तस्य मुष्मन्निर्गताभिरनुग्रहस्य कथाभिश्चमत्कृत्य कथयामासुः किमयं
 यूषद्ः पुत्रो न? 23 तदा सोऽवादीद् ए यिकित्सक स्वमेव स्वस्थं कुरु
 कर्नाडूमि यदत् कृतवान् तदश्रौष्म ताः सर्वाः क्रिया अत्र स्वदेशे कुरु कथामेतां
 यूयमेवावश्यं मां वदिष्यथ | 24 पुनः सोवादीद् युष्मानदं यथार्थं वदामि,
 कोपि भविष्यद्वादी स्वदेशे सत्कारं न प्राप्नोति | 25 अपरत्र यथार्थं वय्मि,
 अेलियस्य ज्वनकाले यदा सार्द्धत्रितयवर्षाणि यावत् जलप्रतिबन्धात्
 सर्वस्मिन् देशे मल्लदुर्भिक्षम् अजनिष्ट तदानीम् एसायेलो देशस्य मध्ये
 बह्व्यो विधवा आसन्, 26 किन्तु सीदोन्प्रदेशीयसारिङ्त्पुरनिवासिनीम्
 अेकां विधवां विना कस्याश्चिदपि समीपे अेलियः प्रेरितो नाभूत् | 27
 अपरत्र एलीशायभविष्यद्वादिविधमानताकाले एसायेल्लेशे बहवः कुष्ठिन
 आसन् किन्तु सुरीयदेशीयं नामान्कुष्ठिनं विना कोप्यन्यः परिष्कृतो नाभूत् |

28 ઇમાં કથાં શ્રુત્વા ભજનગેહસ્થિતા લોકાઃ સક્રોધમ્ ઉત્થાય 29 નગરાત્તં
 બહિષ્કૃત્ય યસ્ય શિખરિણ ઉપરિ તેષાં નગરં સ્થાપિતમાસ્તે તસ્માન્નિક્ષેપ્તું
 તસ્ય શિખરં તં નિન્યુઃ 30 કિન્તુ સ તેષાં મધ્યાદપસૃત્ય સ્થાનાન્તરં જગામ |
 31 તતઃ પરં ચીશુર્ગાલીલ્પ્રદેશીયકફર્નાહૂમ્નગર ઉપસ્થાય વિશ્રામવારે
 લોકાનુપદેષ્ટુમ્ આરબ્ધવાન્ | 32 તદ્દુપદેશાત્ સર્વ્યે ચમચ્યક્રુ ર્યતસ્તસ્ય કથા
 ગુરુતરા આસન્ | 33 તદાનીં તદ્ભજનગેહસ્થિતોડમેધ્યભૂતગ્રસ્ત એકો જન
 ઉચ્ચૈઃ કથયામાસ, 34 હે નાસરતીયચીશોડસ્માન્ ત્યજ, ત્વયા સહાસ્માકં
 કઃ સમ્બન્ધઃ? કિમસ્માન્ વિનાશયિતુમાયાસિ? ત્વમીશ્વરસ્ય પવિત્રો
 જન એતદહં જાનામિ | 35 તદા ચીશુસ્તં તર્જયિત્વાવદત્ મૌની ભવ ઇતો
 બહિર્ભવ; તતઃ સોમેધ્યભૂતસ્તં મધ્યસ્થાને પાતયિત્વા કિન્ચિદ્વ્યહિંસિત્વા
 તસ્માદ્ બહિર્ગતવાન્ | 36 તતઃ સર્વ્યે લોકાશ્ચમત્કૃત્ય પરસ્પરં વક્તુમારેભિરે
 કોયં ચમત્કારઃ | એષ પ્રભાવેણ પરાક્રમેણ ચામેધ્યભૂતાન્ આજ્ઞાપયતિ તેનૈવ
 તે બહિર્ગચ્છન્તિ | 37 અનન્તરં ચતુર્દિક્સ્થદેશાન્ તસ્ય સુખ્યાતિર્વ્યાખ્નોત્ |
 38 તદનન્તરં સ ભજનગેહાદ્ બહિરાગત્ય શિમોનો નિવેશનં પ્રવિવેશ
 તદા તસ્ય શ્વશ્રૂજ્વરેણાત્યન્તં પીડિતાસીત્ શિષ્યાસ્તદર્થં તસ્મિન્ વિનયં
 ચક્રુઃ | 39 તતઃ સ તસ્યાઃ સમીપે સ્થિત્વા જ્વરં તર્જયામાસ તેનૈવ તાં
 જ્વરોડત્યાક્ષીત્ તતઃ સા તત્ક્ષણમ્ ઉત્થાય તાન્ સિષેવે | 40 અથ
 સૂર્યાસ્તકાલે સ્વેષાં યે યે જના નાનારોગૈઃ પીડિતા આસન્ લોકાસ્તાન્ ચીશોઃ
 સમીપમ્ આનિન્યુઃ, તદા સ એકેકસ્ય ગાત્રે કરમર્પયિત્વા તાનારોગાન્ ચકાર |
 41 તતો ભૂતા બહુભ્યો નિર્ગત્ય ચીત્શબ્દં કૃત્વા ચ બભાષિરે ત્વમીશ્વરસ્ય
 પુત્રોડભિષિક્તત્રાતા; કિન્તુ સોભિષિક્તત્રાતેતિ તે વિવિદુરેતસ્માત્ કારણાત્
 તાન્ તર્જયિત્વા તદ્વક્તું નિષિષેધ | 42 અપરઞ્ચ પ્રભાતે સતિ સ વિજનસ્થાનં
 પ્રતસ્થે પશ્ચાત્ જનાસ્તમન્વિચ્છન્તસ્તન્નિકટં ગત્વા સ્થાનાન્તરગમનાર્થં
 તમન્વરુન્ધન્ | 43 કિન્તુ સ તાન્ જગાદ, ઈશ્વરીયરાજ્યસ્ય સુસંવાદં
 પ્રચારયિતુમ્ અન્યાનિ પુરાણ્યપિ મયા યાતવ્યાનિ યતસ્તદર્થમેવ પ્રેરિતોહં |
 44 અથ ગાલીલો ભજનગેહેષુ સ ઉપદિદેશ |

5 અનન્તરં ચીશુરેકદા ગિનેષરથ્દસ્ય તીર ઉત્તિષ્ઠતિ, તદા લોકા ઈશ્વરીયકથાં
 શ્રોતું તદ્દુપરિ પ્રપતિતાઃ | 2 તદાનીં સ દ્દસ્ય તીરસમીપે નૌદ્વયં દદર્શ
 કિન્ચ મત્સ્યોપજીવિનો નાવં વિહાય જાલં પ્રક્ષાલયન્તિ | 3 તતસ્તયોર્દ્વયો

મધ્યે શિમોનો નાવમારુદ્ધ તીરાત્ કિઞ્ચિદ્દૂરં યાતું તસ્મિન્ વિનયં કૃત્વા
 નૌકાયમુપવિશ્ય લોકાન્ પ્રોપદિષ્ટવાન્ | 4 પશ્ચાત્ તં પ્રસ્તાવં સમાપ્ય
 સ શિમોનં વ્યાજહાર, ગભીરં જલં ગત્વા મત્સ્યાન્ ધર્તુ જાલં નિક્ષિપ |
 5 તતઃ શિમોન બભાષે, હે ગુરો યદપિ વયં કૃત્સ્નાં યામિનીં પરિશ્રમ્ય
 મત્સ્યૈકમપિ ન પ્રાપ્તાસ્તથાપિ ભવતો નિદેશતો જાલં ક્ષિપામઃ | 6 અથ
 જાલે ક્ષિપ્તે બહુમત્સ્યપતનાદ્ આનાયઃ પ્રચ્છિન્નઃ | 7 તસ્માદ્ ઉપકર્તુમ્
 અન્યનીસ્થાન્ સક્ષિન્ આયાતુમ્ ઇક્ષિતેન સમાહ્વયન્ તતસ્ત આગત્ય
 મત્સ્યૈ નૌદ્વયં પ્રપૂરયામાસુ ર્યૈ નૌદ્વયં પ્રમગ્નમ્ | 8 તદા શિમોન્પિતરસ્તદ્
 વિલોક્ય યીશોશ્ચરણયોઃ પતિત્વા, હે પ્રભોહં પાપી નરો મમ નિકટાદ્ ભવાન્
 યાતુ, ઇતિ કથિતવાન્ | 9 યતો જાલે પતિતાનાં મત્સ્યાનાં યૂથાત્ શિમોન્
 તત્સક્ષિન્શ્ચ યમત્કૃતવન્તઃ; શિમોનઃ સહકારિણૌ સિવદેઃ પુત્રૌ યાકૂબ્ યોહન્
 યેમૌ તાદૃશૌ બભૂવતુઃ | 10 તદા યીશુઃ શિમોનં જગાદ મા ભૈષીરધારભ્ય
 ત્વં મનુષ્યધરો ભવિષ્યસિ | 11 અનન્તરં સર્વાસુ નૌસુ તીરમ્ આનીતાસુ
 તે સર્વાન્ પરિત્યજ્ય તસ્ય પશ્ચાદ્ગામિનો બભૂવુઃ | 12 તતઃ પરં યીશૌ
 કસ્મિંશ્ચિત્ પુરે તિષ્ઠતિ જન એકઃ સર્વાઙ્ગકુષ્ઠસ્તં વિલોક્ય તસ્ય સમીપે
 ન્યુબ્જઃ પતિત્વા સવિનયં વક્તુમારેભે, હે પ્રભો યદિ ભવાનિચ્છતિ તર્હિ માં
 પરિષ્કર્તુ શક્નોતિ | 13 તદાનીં સ પાણિં પ્રસાર્ય તદઙ્ગં સ્પૃશન્ બભાષે ત્વં
 પરિષ્કિયસ્વેતિ મમેચ્છાસ્તિ તતસ્તત્ક્ષણં સ કુષ્ઠાત્ મુક્તઃ | 14 પશ્ચાત્ સ
 તમાજ્ઞાપયામાસ કથામિમાં કસ્મૈચિદ્ અકથયિત્વા યાજકસ્ય સમીપઞ્ચ ગત્વા
 સ્વં દર્શય, લોકેભ્યો નિજપરિષ્કૃતત્વસ્ય પ્રમાણદાનાય મૂસાજ્ઞાનુસારેણ
 દ્રવ્યમુત્મૃજસ્વ ય | 15 તથાપિ યીશોઃ સુખ્યાતિ ભૃહુ વ્યાપ્તુમારેભે કિઞ્ચ
 તસ્ય કથાં શ્રોતું સ્વીયરોગેભ્યો મોક્તુઞ્ચ લોકા આજગ્મુઃ | 16 અથ
 સ પ્રાન્તરં ગત્વા પ્રાર્થયાઞ્ચક્રે | 17 અપરઞ્ચ એકદા યીશુરુપદિશતિ,
 એતર્હિ ગાલીલ્લિહૂદાપ્રદેશયોઃ સર્વનગરેભ્યો ચિરૂશાલમશ્ચ કિયન્તઃ
 ક્ષિરૂશિલોકા વ્યવસ્થાપકાશ્ચ સમાગત્ય તદન્તિકે સમુપવિવિશુઃ, તસ્મિન્
 કાલે લોકાનામારોગ્યકારણાત્ પ્રભોઃ પ્રભાવઃ પ્રચકાશે | 18 પશ્ચાત્
 કિયન્તો લોકા એકં પક્ષાઘાતિનં ખદ્વાયાં નિધાય યીશોઃ સમીપમાનેતું
 સમ્મુખે સ્થાપયિતુઞ્ચ વ્યાપ્રિયન્ત | 19 કિન્તુ બહુજનનિવહસમ્વાધાત્
 ન શક્નુવન્તો ગૃહોપરિ ગત્વા ગૃહપૃષ્ઠં ખનિત્વા તં પક્ષાઘાતિનં સખદ્વં

ગૃહમધ્યે યીશોઃ સમ્મુખે ડવરોહયામાસુઃ | 20 તદા યીશુસ્તેષામ્ ઈદૃશં
 વિશ્વાસં વિલોક્ય તં પક્ષાઘાતિનં વ્યાજહાર, હે માનવ તવ પાપમક્ષમ્યત |
 21 તસ્માદ્ અધ્યાપકાઃ ફિરુશિનશ્ચ ચિતૈરિત્યં પ્રચિન્તિતવન્તઃ, ઔષ જન
 ઈશ્વરં નિન્દતિ કોયં? કેવલમીશ્વરં વિના પાપં ક્ષન્તુ કઃ શક્નોતિ? 22
 તદા યીશુસ્તેષામ્ ઈત્યં ચિન્તનં વિદિત્વા તેભ્યોકથયદ્ યૂયં મનોભિઃ
 કુતો વિતર્કયથ? 23 તવ પાપક્ષમા જાતા યદ્વા ત્વમુત્થાય વ્રજ એતયો
 મધ્યે કા કથા સુકથ્યા? 24 કિન્તુ પૃથિવ્યાં પાપં ક્ષન્તુ માનવસુતસ્ય
 સામર્થ્યમસ્તીતિ યથા યૂયં જ્ઞાતું શક્નુથ તદર્થ (સ તં પક્ષાઘાતિનં જગાદ)
 ઉત્તિષ્ઠ સ્વશય્યાં ગૃહીત્વા ગૃહં યાહીતિ ત્વામાદિશામિ | 25 તસ્માત્ સ
 તત્ક્ષણમ્ ઉત્થાય સર્વોષાં સાક્ષાત્ નિજશયનીયં ગૃહીત્વા ઈશ્વરં ધન્યં વદન્
 નિજનિવેશનં યયૌ | 26 તસ્માત્ સર્વે વિસ્મય પ્રાપ્તા મનઃસુ ભીતાશ્ચ
 વયમધાસમ્ભવકાર્યાર્ણ્યદર્શામ ઇત્યુક્ત્વા પરમેશ્વરં ધન્યં પ્રોદિતાઃ | 27
 તતઃ પરં બહિર્ગચ્છન્ કરસત્રયસ્થાને લેવિનામાનં કરસત્રાયકં દૃષ્ટ્વા
 યીશુસ્તમભિદધે મમ પશ્રાદેહિ | 28 તસ્માત્ સ તત્ક્ષણાત્ સર્વે પરિત્યજ્ય
 તસ્ય પશ્રાદિયાય | 29 અનન્તરં લેવિ નિજગૃહે તદર્થ મહાભોજ્યં ચકાર,
 તદા તૈઃ સહાનેકે કરસત્રાધિનસ્તદન્યલોકાશ્ચ ભોક્તુમુપવિવિશુઃ | 30
 તસ્માત્ કારણાત્ ચાણ્ડાલાનાં પાપિલોકાનાઞ્ચ સર્જે યૂયં કુતો ભંગ્ધ્વે પિવથ
 ચેતિ કથાં કથયિત્વા ફિરુશિનોડધ્યાપકાશ્ચ તસ્ય શિષ્યૈઃ સહ વાગ્યુદ્ધં
 કર્તુમારેભિરે | 31 તસ્માદ્ યીશુસ્તાન્ પ્રત્યવોચદ્ અરોગલોકાનાં ચિકિત્સકેન
 પ્રયોજનં નાસ્તિ કિન્તુ સરોગાણામેવ | 32 અહં ધાર્મિકાન્ આહ્વાતું
 નાગતોસ્મિ કિન્તુ મનઃ પરાવર્તયિતું પાપિન એવ | 33 તતસ્તે પ્રોચુઃ, યોહનઃ
 ફિરુશિનાઞ્ચ શિષ્યા વારંવારમ્ ઉપવસન્તિ પ્રાર્થયન્તે ચ કિન્તુ તવ શિષ્યાઃ
 કુતો ભુજ્જતે પિવન્તિ ચ? 34 તદા સ તાનાયખ્યૌ વરે સર્જે તિષ્ઠતિ વરસ્ય
 સમ્પિગણં કિમુપવાસયિતું શક્નુથ? 35 કિન્તુ યદા તેષાં નિકટાદ્ વરો
 નેષ્યતે તદા તે સમુપવત્સ્યન્તિ | 36 સોપરમપિ દૃષ્ટાન્તં કથયામ્બભૂવ
 પુરાતનવસ્ત્રે કોપિ નુતનવસ્ત્રં ન સીવ્યતિ યતસ્તેન સેવનેન જીર્ણવસ્ત્રં
 છિધતે, નૂતનપુરાતનવસ્ત્રયો મૈલઞ્ચ ન ભવતિ | 37 પુરાતન્યાં કુત્વાં કોપિ
 નુતનં દ્રાક્ષારસં ન નિદધાતિ, યતો નવીનદ્રાક્ષારસસ્ય તેજસા પુરાતની કુતૂ
 વિદીર્થ્યતે તતો દ્રાક્ષારસઃ પતતિ કુતૂશ્ચ નશ્યતિ | 38 તતો હેતો નૂતન્યાં

કુત્વાં નવીનદ્રાક્ષારસઃ નિઘાતવ્યસ્તેનોભયસ્ય રક્ષા ભવતિ | 39 અપરઞ્ચ પુરાતનં દ્રાક્ષારસં પીત્વા કોપિ નૂતનં ન વાઞ્છતિ, યતઃ સ વક્તિ નૂતનાત્ પુરાતનમ્ પ્રશસ્તમ્ |

6 અચરઞ્ચ પર્વણો દ્વિતીયદિનાત્ પરં પ્રથમવિશ્રામવારે શસ્યક્ષેત્રેણ યીશોર્ગમનકાલે તસ્ય શિષ્યાઃ કણિશં છિત્વા કરેષુ મર્દયિત્વા ખાદિતુમારેભિરે | 2 તસ્માત્ કિયન્તઃ ક્ષિરશિનસ્તાનવદન્ વિશ્રામવારે યત્ કર્મ્મ ન કર્તવ્યં તત્ કુતઃ કુરુથ? 3 યીશુઃ પ્રત્યુવાય દાયૂદ્ તસ્ય સક્ષિનશ્ચ ક્ષુધાર્તાઃ કિં યકુઃ સ કથમ્ ઈશ્વરસ્ય મન્દિરં પ્રવિશ્ય 4 યે દર્શનીયાઃ પૂપા યાજકાન્ વિનાન્યસ્ય કસ્યાપ્યભોજનીયાસ્તાનાનીય સ્વયં બુભજે સક્ષિભ્યોપિ દદૌ તત્ કિં યુષ્માભિઃ કદાપિ નાપાઠિ? 5 પશ્ચાત્ સ તાનવદત્ મનુજસુતો વિશ્રામવારસ્યાપિ પ્રભુ ભવતિ | 6 અનન્તરમ્ અન્યવિશ્રામવારે સ ભજનગેહં પ્રવિશ્ય સમુપદિશતિ | તદા તત્સ્થાને શુષ્કદક્ષિણકર એકઃ પુમાન્ ઉપતસ્થિવાન્ | 7 તસ્માદ્ અધ્યાપકાઃ ક્ષિરશિનશ્ચ તસ્મિન્ દોષમારોપયિતું સ વિશ્રામવારે તસ્ય સ્વાસ્થ્યં કરોતિ નવેતિ પ્રતીક્ષિતુમારેભિરે | 8 તદા યીશુસ્તેષાં ચિન્તાં વિદિત્વા તં શુષ્કકરં પુમાંસં પ્રોવાય, ત્વમુત્થાય મધ્યસ્થાને તિષ્ઠ | 9 તસ્માત્ તસ્મિન્ ઉત્થિતવતિ યીશુસ્તાન્ વ્યાજહાર, યુષ્માન્ ઇમાં કથાં પૃચ્છામિ, વિશ્રામવારે હિતમ્ અહિતં વા, પ્રાણરક્ષણં પ્રાણનાશનં વા, એતેષાં કિં કર્મ્મકરણીયમ્? 10 પશ્ચાત્ યતુર્દિક્ષુ સર્વાન્ વિલોક્ય તં માનવં બભાષે, નિજકરં પ્રસારય; તતસ્તેન તથા કૃત ઇતરકરવત્ તસ્ય હસ્તઃ સ્વસ્થોભવત્ | 11 તસ્માત્ તે પ્રચાણકોપાન્વિતા યીશું કિં કરિષ્યન્તીતિ પરસ્પરં પ્રમન્ત્રિતાઃ | 12 તતઃ પરં સ પર્વતમારુહ્યેશ્વરમુદ્દિશ્ય પ્રાર્થયમાનઃ કૃત્સ્નાં રાત્રિં યાપિતવાન્ | 13 અથ દિને સતિ સ સર્વાન્ શિષ્યાન્ આહૂતવાન્ તેષાં મધ્યે 14 પિતરનામ્ના ખ્યાતઃ શિમોન્ તસ્ય ભ્રાતા આન્દ્રિયશ્ચ યાકૂબ્ યોહન્ ય ક્ષિલિપ્ બર્થલમયશ્ચ 15 મથિઃ થોમા આલ્ફીયસ્ય પુત્રો યાકૂબ્ જવલન્તનામ્ના ખ્યાતઃ શિમોન્ 16 ય યાકૂબો ભ્રાતા ચિહૂદાશ્ચ તં યઃ પરકરેષુ સમર્પયિષ્યતિ સ ઇષ્કરીયોતીયચિહૂદાશ્ચૈતાન્ દ્વાદશ જનાન્ મનોનીતાન્ કૃત્વા સ જગ્રાહ તથા પ્રેરિત ઇતિ તેષાં નામ યકાર | 17 તતઃ પરં સ તૈઃ સહ પર્વતાદવરુહ્ય ઉપત્યકાયાં તસ્થૌ તતસ્તસ્ય શિષ્યસક્ષ્ણો ચિહૂદાદેશાદ્ ચિરૂશાલમશ્ચ સોરઃ સીદોનશ્ચ જલધે રોઘસો

જનનિહાશ્ચ એત્ય તસ્ય કથાશ્રવાણાર્થ રોગમુક્ત્યર્થઞ્ચ તસ્ય સમીપે તસ્થુઃ |
 18 અમેધ્યભૂતગ્રસ્તાશ્ચ તન્નિકટમાગત્ય સ્વાસ્થ્યં પ્રાપુઃ | 19 સર્વેષાં
 સ્વાસ્થ્યકરણપ્રભાવસ્ય પ્રકાશિતત્વાત્ સર્વે લોકા એત્ય તં સ્પ્રષ્ટું યેતિરે |
 20 પશ્યાત્ સ શિષ્યાન્ પ્રતિ દૃષ્ટિં કૃત્વા જગાદ, હે દરિદ્રા યૂયં ધન્યા યત
 ઇશ્વરીયે રાજ્યે વોડધિકારોસ્તિ | 21 હે અધુના ક્ષુધિતલોકા યૂયં ધન્યા યતો
 યૂયં તપ્સ્યથ; હે ઇહ રોદિનો જના યૂયં ધન્યા યતો યૂયં હસિષ્યથ | 22 યદા
 લોકા મનુષ્યસૂનો નામહેતો યુષ્માન્ ઋતીયિષ્યન્તે પૃથક્ કૃત્વા નિન્દિષ્યન્તિ,
 અધમાનિવ યુષ્માન્ સ્વસમીપાદ્ દૂરીકરિષ્યન્તિ ચ તદા યૂયં ધન્યાઃ | 23 સ્વર્ગે
 યુષ્માકં યથેષ્ટં ફલં ભવિષ્યતિ, એતદર્થં તસ્મિન્ દિને પ્રોલ્લસત આનન્દેન
 નૃત્યત ચ, તેષાં પૂર્વપુરુષાશ્ચ ભવિષ્યદ્વાદિનઃ પ્રતિ તથૈવ વ્યવાહરન્ | 24
 કિન્તુ હા હા ધનવન્તો યૂયં સુખં પ્રાપ્નુત | હન્ત પરિતૃપ્તા યૂયં ક્ષુધિતા
 ભવિષ્યથ; 25 ઇહ હસન્તો યૂયં વત યુષ્માભિઃ શોચિતવ્યં રોદિતવ્યઞ્ચ |
 26 સર્વેલાકૈ યુષ્માકં સુખ્યાતૌ કૃતાયાં યુષ્માકં દુર્ગતિ ભવિષ્યતિ યુષ્માકં
 પૂર્વપુરુષા મૃષાભવિષ્યદ્વાદિનઃ પ્રતિ તદ્વત્ કૃતવન્તઃ | 27 હે શ્રોતારો
 યુષ્મભ્યમહં કથયામિ, યૂયં શત્રુષુ પ્રીયધ્વં યે ચ યુષ્માન્ દ્વિષન્તિ તેષામપિ
 હિતં કુરુત | 28 યે ચ યુષ્માન્ શપન્તિ તેભ્ય આશિષં દત્ત યે ચ યુષ્માન્
 અવમન્યન્તે તેષાં મજ્જલં પ્રાર્થયધ્વં | 29 યદિ કશ્ચિત્ તવ કપોલે ચપેટાઘાતં
 કરોતિ તર્હિ તં પ્રતિ કપોલમ્ અન્યં પરાવર્ત્ય સમ્મુખીકુરુ પુનશ્ચ યદિ કશ્ચિત્
 તવ ગાત્રીયવસ્ત્રં હરતિ તર્હિ તં પરિઘેયવસ્ત્રમ્ અપિ ગ્રહીતું મા વારય | 30
 યસ્ત્વાં યાયતે તસ્મૈ દેહિ, યશ્ચ તવ સમ્પત્તિં હરતિ તં મા યાયસ્વ | 31
 પરેભ્યઃ સ્વાન્ પ્રતિ યથાયરણમ્ અપેક્ષધ્વે પરાન્ પ્રતિ યૂયમપિ તથાયરત |
 32 યે જના યુષ્માસુ પ્રીયન્તે કેવલં તેષુ પ્રીયમાણેષુ યુષ્માકં કિં ફલં?
 પાપિલોકા અપિ સ્વેષુ પ્રીયમાણેષુ પ્રીયન્તે | 33 યદિ હિતકારિણ એવ હિતં
 કુરુથ તર્હિ યુષ્માકં કિં ફલં? પાપિલોકા અપિ તથા કુર્વન્તિ | 34 યેભ્ય
 ઋણપરિશોધસ્ય પ્રાપ્તિપ્રત્યાશાસ્તે કેવલં તેષુ ઋણે સમર્પિતે યુષ્માકં કિં
 ફલં? પુનઃ પ્રાપ્ત્યાશયા પાપીલોકા અપિ પાપિજનેષુ ઋણમ્ અર્પયન્તિ | 35
 અતો યૂયં રિપુષ્વપિ પ્રીયધ્વં, પરહિતં કુરુત ચ; પુનઃ પ્રાપ્ત્યાશાં ત્યક્ત્વા
 ઋણમર્પયત, તથા કૃતે યુષ્માકં મહાફલં ભવિષ્યતિ, યૂયઞ્ચ સર્વપ્રધાનસ્ય
 સન્તાના ઇતિ ખ્યાતિં પ્રાપ્સ્યથ, યતો યુષ્માકં પિતા કૃતદનાનાં દુર્વૃત્તાનાઞ્ચ

छितमायरति | 36 अत अेव स यथा दयालु रूयमपि तादृशा दयालवो
 भवत | 37 अपरञ्च परान् दौषिणो मा कुरुत तस्माद् यूयं दौषीकृता न
 भविष्यथ; अदएडयान् मा दएडयत तस्माद् यूयमपि दएडं न प्राप्स्यथ;
 परेषां दौषान् क्षमध्वं तस्माद् युष्माकमपि दौषाः क्षमिष्यन्ते | 38 दानानिदत्त
 तस्माद् यूयं दानानि प्राप्स्यथ, वरञ्च लोकाः परिमाणपात्रं प्रदलय्य सञ्चाल्य
 प्रोञ्चाल्य परिपूर्य्य युष्माकं क्लोडेषु समर्पयिष्यन्ति; यूयं येन परिमाणेन
 परिमाथ तेनेव परिमाणेन युष्मत्कृते परिमास्यते | 39 अथ स तेभ्यो
 दृष्टान्तकथामकथयत्, अन्धो जनः किमन्धं पन्थानं दर्शयितुं शक्नोति? तस्माद्
 उभावपि किं गर्तं न पतिष्यतः? 40 गुरोः शिष्यो न श्रेष्ठः किन्तु शिष्ये सिद्धे
 सति स गुरुतुल्यो भवितुं शक्नोति | 41 अपरञ्च त्वं स्वयक्षुषि नासाम्
 अदृष्ट्वा तव भ्रातृश्रक्षुषि यत्तृणमस्ति तदेव कुतः पश्यमि? 42 स्वयक्षुषि
 या नासा विधते ताम् अज्ञात्वा, भ्रातस्तव नेत्रात् तृणं बहिः करोमीति
 वाक्यं भ्रातरं कथं वक्तुं शक्नोषि? हे कपटिन् पूर्वं स्वनयनात् नासां बहिः
 कुरु ततो भ्रातृश्रक्षुषस्तृणं बहिः कर्तुं सुदृष्टिं प्राप्स्यसि | 43 अन्यञ्च
 उत्तमस्तरुः कदापि इलमनुत्तमं न इलति, अनुत्तमतरुश्च इलमुत्तमं न इलति
 कारणादतः इलैस्तरवो ज्ञायन्ते | 44 कएटकिपादपात् कोपि उडुम्बरइलानि
 न पातयति तथा शृगालकोलिवृक्षादपि कोपि द्राक्षाइलं न पातयति | 45 तद्वत्
 साधुलोकोऽन्तःकरणरूपात् सुभाएडागाराद् उत्तमानि द्रव्याणि बहिः करोति,
 दुष्टो लोकाश्रान्तःकरणरूपात् कुभाएडागारात् कुत्सितानि द्रव्याणि निर्गमयति
 यतोऽन्तःकरणाणां पूर्णाभावानुत्तमपाणि वयांसि भुञ्जन्तिर्गच्छन्ति | 46
 अपरञ्च ममाज्ञानुत्तमं नायरित्वा कुतो मां प्रभो प्रभो षति वदथ? 47
 यः कश्चिन् मम निकटम् आगत्य मम कथा निशम्य तदनुत्तमं कर्म करोति
 स कस्य सदृशो भवति तदहं युष्मान् ज्ञापयामि | 48 यो जनो गल्भीरं
 भ्नित्वा पाषाणस्थले भित्तिं निर्माय स्वगृहं रथयति तेन सह तस्योपमा
 भवति; यत आप्लाविजलमेत्य तस्य मूले वेगेन वडदपि तद्गृहं लाडयितुं न
 शक्नोति यतस्तस्य भित्तिः पाषाणोपरि तिष्ठति | 49 किन्तु यः कश्चिन् मम
 कथाः श्रुत्वा तदनुत्तमं नायरति स भित्तिं विना मूढुपरि गृहनिर्मात्रा समानो
 भवति; यत आप्लाविजलमागत्य वेगेन यदा वडति तदा तद्गृहं पतति तस्य
 महत् पतनं जायते |

7 તતઃ પરં સ લોકાનાં કર્ણગોચરે તાન્ સર્વાન્ ઉપદેશાન્ સમાપ્ય યદા કર્ણાહૂમ્પુરં પ્રવિશતિ 2 તદા શતસેનાપતેઃ પ્રિયદાસ એકો મૃતકલ્પઃ પીડિત આસીત્ | 3 અતઃ સેનાપતિ ર્ચીશો વર્તાર્તા નિશમ્ય દાસસ્યારોગ્યકરણાય તસ્યાગમનાર્થં વિનયકરણાય ચિહ્નદીયાન્ કિયતઃ પ્રાયઃ પ્રેષયામાસ | 4 તે યીશોરન્તિકં ગત્વા વિનયાતિશયં વક્તુમારેભિરે, સ સેનાપતિ ભવતોનુગ્રહં પ્રાપ્તુમ્ અર્હતિ | 5 યતઃ સોસ્મજજાતીયેષુ લોકેષુ પ્રીયતે તથાસ્મત્કૃતે ભજનગેહં નિર્મિતવાન્ | 6 તસ્માદ્ યીશુસ્તૈઃ સહ ગત્વા નિવેશનસ્ય સમીપં પ્રાપ, તદા સ શતસેનાપતિ વર્ક્ષ્યમાણવાક્યં તં વક્તું બન્ધૂન્ પ્રાહિણોત્ | હે પ્રભો સ્વયં શ્રમો ન કર્તવ્યો યદ્ ભવતા મદ્રેહમધ્યે પાદાર્પણં ક્રિયેત તદપ્યહં નાર્હામિ, 7 કિઞ્ચાહં ભવત્સમીપં યાતુમપિ નાત્માનં યોગ્યં બુદ્ધવાન્, તતો ભવાન્ વાક્યમાત્રં વદતુ તેનૈવ મમ દાસઃ સ્વસ્થો ભવિષ્યતિ | 8 યસ્માદ્ અહં પરાધીનોપિ મમાધીના યાઃ સેનાઃ સન્તિ તાસામ્ એકજનં પ્રતિ યાહીતિ મયા પ્રોક્તે સ યાતિ; તદન્યં પ્રતિ આયાહીતિ પ્રોક્તે સ આયાતિ; તથા નિજદાસં પ્રતિ એતત્ કુર્વિતિ પ્રોક્તે સ તદેવ કરોતિ | 9 યીશુરિદં વાક્યં શ્રુત્વા વિસ્મયં યયૌ, મુખં પરાવર્ત્ય પશ્ચાદ્વર્તિનો લોકાન્ બભાષે ચ, યુષ્માનહં વદામિ ઇન્દ્રાયેલો વંશમધ્યેપિ વિશ્વાસમીદૃશં ન પ્રાપ્નવં | 10 તતસ્તે પ્રેષિતા ગૃહં ગત્વા તં પીડિતં દાસં સ્વસ્થં દદૃશુઃ | 11 પરેડહનિ સ નાથીનાપ્યં નગરં જગામ તસ્યાનેકે શિષ્યા અન્યે ચ લોકાસ્તેન સાદ્ધૃં યયુઃ | 12 તેષુ તન્નગરસ્ય દ્વારસન્નિધિં પ્રાપ્તેષુ કિયન્તો લોકા એકં મૃતમનુજં વહન્તો નગરસ્ય બહિર્યાન્તિ, સ તન્માતુરેકપુત્રસ્તન્માતા ચ વિધવા; તયા સાદ્ધૃં તન્નગરીયા બહવો લોકા આસન્ | 13 પ્રભુસ્તાં વિલોક્ય સાનુકમ્પઃ કથયામાસ, મા રોદીઃ | સ સમીપમિત્વા ખદ્વાં પસ્પર્શ તસ્માદ્ વાહકાઃ સ્થગિતાસ્તમ્યુઃ; 14 તદા સ ઉવાચ હે યુવમનુષ્ય ત્વમુત્તિષ્ઠ, ત્વામહમ્ આજ્ઞાપયામિ | 15 તસ્માત્ સ મૃતો જનસ્તત્ક્ષણમુત્થાય કથાં પ્રકથિતઃ; તતો યીશુસ્તસ્ય માતરિ તં સમર્પયામાસ | 16 તસ્માત્ સર્વે લોકાઃ શશક્ટિરે; એકો મહાભવિષ્યદ્વાદી મધ્યેડસ્માકમ્ સમુદૈત્, ઇશ્વરશ્ચ સ્વલોકાનન્વગૃહ્ણાત્ કથામિમાં કથયિત્વા ઇશ્વરં ધન્યં જગદુઃ | 17 તતઃ પરં સમસ્તં ચિહ્નદાદેશં તસ્ય ચતુર્દિક્સ્થદેશઞ્ચ તસ્યૈતત્કીર્તિં વ્યાનશે | 18 તતઃ પરં યોહનઃ શિષ્યેષુ તં તદ્વૃત્તાન્તં જ્ઞાપિતવત્સુ 19 સ સ્વશિષ્યાણાં દ્વૌ

જનાવાહૂય યીશું પ્રતિ વક્ષ્યમાણં વાક્યં વક્તું પ્રેષયામાસ, યસ્યાગમનમ્
 અપેક્ષ્ય તિષ્ઠામો વયં કિં સ એવ જનસ્ત્વં? કિં વયમન્યમપેક્ષ્ય સ્થાસ્યામઃ?
 20 પશ્ર્ચાત્તૌ માનવૌ ગત્વા કથયામાસતુઃ, યસ્યાગમનમ્ અપેક્ષ્ય તિષ્ઠામો
 વયં, કિં સએવ જનસ્ત્વં? કિં વયમન્યમપેક્ષ્ય સ્થાસ્યામઃ? કથામિમાં તુભ્યં
 કથયિતું યોહન્ મજ્જક આવાં પ્રેષિતવાન્ | 21 તસ્મિન્ દણ્ડે યીશૂરોગિણો
 મહાવ્યાધિમતો દુષ્ટભૂતગ્રસ્તાંશ્ચ બહૂન્ સ્વસ્થાન્ કૃત્વા, અનેકાન્ધેભ્યશ્ચક્ષુષિ
 દત્વા પ્રત્યુવાચ, 22 યુવાં વ્રજતમ્ અન્ધા નેત્રાણિ ખજ્જાશ્ચરણાણિ ચ
 પ્રાપ્નુવન્તિ, કુષ્ઠિનઃ પરિષ્ઠિયન્તે, બધિરાઃ શ્રવણાણિ મૃતાશ્ચ જીવનાણિ
 પ્રાપ્નુવન્તિ, દરિદ્રાણાં સમીપેષુ સુસંવાદઃ પ્રચાર્યન્તે, યં પ્રતિ વિદ્નસ્વરૂપોહં
 ન ભવામિ સ ધન્યઃ, 23 એતાણિ યાણિ પશ્યથઃ શૃણુથશ્ચ તાણિ યોહનં
 જ્ઞાપયતમ્ | 24 તયો દૂતયો ગતયોઃ સતો યોહનિ સ લોકાન્ વક્તુમુપયક્રમે,
 યૂયં મધ્યેપ્રાન્તરં કિં દ્રષ્ટું નિરગમત? કિં વાયુના કમ્પિતં નડં? 25 યૂયં કિં દ્રષ્ટું
 નિરગમત? કિં સૂક્ષ્મવસ્ત્રપરિધાયિનં કમપિ નરં? કિન્તુ યે સૂક્ષ્મમુદુવસ્ત્રાણિ
 પરિદધતિ સૂતમાણિ દ્રવ્યાણિ ભુજ્જતે ચ તે રાજધાનીષુ તિષ્ઠન્તિ | 26 તર્હિ
 યૂયં કિં દ્રષ્ટું નિરગમત? કિમેકં ભવિષ્યદ્વાદિનં? તદેવ સત્યં કિન્તુ સ પુમાન્
 ભવિષ્યદ્વાદિનોપિ શ્રેષ્ઠ ઇત્યહં યુષ્માન્ વદામિ; 27 પશ્ય સ્વકીયદૂતન્તુ
 તવાગ્ર પ્રેષયામ્યહં | ગત્વા ત્વદીયમાર્ગન્તુ સ હિ પરિષ્કરિષ્યતિ | યદર્થે
 લિપિરિયમ્ આસ્તે સ એવ યોહન્ | 28 અતો યુષ્માનહં વદામિ સ્ત્રિયા
 ગર્ભજાતાનાં ભવિષ્યદ્વાદિનાં મધ્યે યોહનો મજ્જકાત્ શ્રેષ્ઠઃ કોપિ નાસ્તિ,
 તત્રાપિ ઈશ્વરસ્ય રાજ્યે યઃ સર્વ્વસ્માત્ ક્ષુદ્રઃ સ યોહનોપિ શ્રેષ્ઠઃ | 29
 અપરઞ્ચ સર્વ્વે લોકાઃ કરમઞ્ચાયિનશ્ચ તસ્ય વાક્યાણિ શ્રુત્વા યોહના મજ્જનેન
 મજ્જિજતાઃ પરમેશ્વરં નિર્દોષં મેનિરે | 30 કિન્તુ ક્ષિરશિનો વ્યવસ્થાપકાશ્ચ
 તેન ન મજ્જિજતાઃ સ્વાન્ પ્રતીશ્વરસ્યોપદેશં નિષ્કલમ્ અકુર્વ્વન્ | 31 અથ
 પ્રભુઃ કથયામાસ, ઇદાનીન્તનજનાન્ કેનોપમામિ? તે કસ્ય સદૃશાઃ? 32
 યે બાલકા વિપાણ્યામ્ ઉપવિશ્ય પરસ્પરમ્ આહૂય વાક્યમિદં વદન્તિ,
 વયં યુષ્માકં નિકટે વંશીરવાદિષ્મ, કિન્તુ યૂયં નાનર્તિષ્ઠ, વયં યુષ્માકં
 નિકટ અરોદિષ્મ, કિન્તુ યુયં ન વ્યલપિષ્ઠ, બાલકૈરેતાદૃશૈસ્તેષામ્ ઉપમા
 ભવતિ | 33 યતો યોહન્ મજ્જક આગત્ય પૂપં નાખાદત્ દ્રાક્ષારસઞ્ચ
 નાપિવત્ તસ્માદ્ યૂયં વદથ, ભૂતગ્રસ્તોયમ્ | 34 તતઃ પરં માનવસુત

आगत्याभादपिवञ्च तस्माद् यूयं वदथ, भादकः सुरापश्चाद्दालपापिनां
 बन्धुरेको जनो दृश्यताम् | 35 किन्तु ज्ञानिनो ज्ञानं निर्दोषं विदुः | 36
 पश्चादकः द्विजशी यीशुं भोजनाय न्यमन्त्रयत् ततः स तस्य गृहं गत्वा
 भोक्तुमुपविष्टः | 37 अतर्हि तत्स्त्रिंशिनो गृहे यीशु भोक्तुम् उपवेक्षीत्
 तच्छ्रुत्वा तन्नगरवासिनी कापि दृष्ट्वा नारी पाण्डुरप्रस्तरस्य सम्भुटके
 सुगन्धितैलम् आनीय 38 तस्य पश्चात् पादयोः सन्निधौ तस्यौ रुदती य
 नेत्राभ्युत्थितस्य यरणौ प्रक्षाल्य निजकयैरमाक्षीत्, ततस्तस्य यरणौ
 युष्मिन्त्वा तेन सुगन्धितैलेन मर्मद | 39 तस्मात् स निमन्त्रयिता द्विजशी
 मनसा यिन्त्यामास, यद्यं भविष्यद्वाही भवेत् तर्हि अंनं स्पृशति या स्त्री
 सा का कीदृशी येति ज्ञातुं शक्नुयात् यतः सा दृष्ट्वा | 40 तदा याशुस्तं जगाद,
 हे शिमोन् त्वां प्रति मम किञ्चिद् वक्तव्यमस्ति; तस्मात् स बभाषे, हे गुरो
 तद् वदतु | 41 अकोत्तमार्णस्य द्वावधमार्णवास्तां, तयोरेकः पञ्चशतानि
 मुद्रापादान् अपरश्च पञ्चाशत् मुद्रापादान् धारयामास | 42 तदनन्तरं तयोः
 शोध्याभावात् स उत्तमार्णस्तयो ऋणो यक्षमे; तस्मात् तयोर्द्वयोः कस्तस्मिन्
 प्रेष्यते बहु? तद् ब्रूहि | 43 शिमोन् प्रत्युवाच, मया बुध्यते यस्याधिकम्
 ऋणं यक्षमे स एति; ततो यीशुस्तं व्याजहार, त्वं यथार्थं व्यचारयः | 44
 अथ तां नारीं प्रति व्याघुठय शिमोनमवोचत्, स्त्रीमिमां पश्यसि? तव
 गृहे मय्यागते त्वं पादप्रक्षालनार्थं जलं नादाः किन्तु योषिदेषा नयनजलै
 र्भम पादौ प्रक्षाल्य केशैरमाक्षीत् | 45 त्वं मां नायुष्मीः किन्तु योषिदेषा
 स्वीयागमनादारभ्य मदीयपादौ युष्मितुं न व्यरंस्त | 46 त्वञ्च मदीयोत्तमाङ्गे
 किञ्चिदपि तैलं नामर्दीः किन्तु योषिदेषा मम यरणौ सुगन्धितैलेनामर्दीत् |
 47 अतस्त्वां व्याहरामि, अतस्या बहु पापमक्षम्यत ततो बहु प्रीयते
 किन्तु यस्याल्पपापं क्षम्यते सोऽल्पं प्रीयते | 48 ततः परं स तां बभाषे,
 त्वदीयं पापमक्षम्यत | 49 तदा तेन सार्द्धं ये भोक्तुम् उपविशुस्ते परस्परं
 वक्तुमारेभिरे, अयं पापं क्षमते क अेषः? 50 किन्तु स तां नारीं जगाद, तव
 विश्वासस्त्वां पर्यत्रास्त त्वं क्षेमेण प्रज |

8 अपरञ्च यीशु द्वादशभिः शिष्यैः सार्द्धं नानानगरेषु नानाग्रामेषु य
 गच्छन् ईश्वरीयराजत्वस्य सुसंवाहं प्रचारयितुं प्रारेभे | 2 तदा यस्याः
 सप्त भूता निरगच्छन् सा मगदलीनीति विख्याता भरियम् हेरोद्राजस्य

गृहाधिपतेः ङोषे र्भाव्यां योऽना शूशाना 3 प्रभृतयो या भव्यः स्त्रियः
 दृष्टभूतेभ्यो रोगेभ्यश्च मुक्ताः सत्यो निजविभूती व्यथित्वा तमसेवन्त,
 ताः सर्वास्तेन सार्द्धम् आसन्। 4 अनन्तरं नानानगरेभ्यो बहवो
 लोका आगत्य तस्य समीपेऽमिलन्, तदा स तेभ्य अेकां दृष्टान्तकथां
 कथयामास। अेकः कृषीबलो बीजानि वप्तुं बहिर्जगाम, 5 ततो वपनकाले
 कतिपयानि बीजानि मार्गपार्श्वे पेतुः, ततस्तानि पदतलै र्दलितानि पक्षिभि
 र्भक्षितानि य। 6 कतिपयानि बीजानि पाषाणस्थले पतितानि यधपि
 तान्यङ्कुरितानि तथापि रसाभावात् शुशुभुः। 7 कतिपयानि बीजानि
 कण्टकिवनमध्ये पतितानि ततः कण्टकिवनानि संवृद्ध्य तानि जग्रसुः।
 8 तदन्यानि कतिपयबीजानि य भूम्यामुत्तमायां पेतुस्ततस्तान्यङ्कुरयित्वा
 शतगुणानि इलानि इेलुः। स एमा कथां कथयित्वा प्रोवाय, यस्य
 श्रोतुं श्रोत्रे स्तः स शृणोतु। 9 ततः परं शिष्यास्तं पप्रच्छुरस्य दृष्टान्तस्य
 किं तात्पर्यं? 10 ततः स व्याजहार, ईश्वरीयराज्यस्य गुह्यानि ज्ञातुं
 युष्मभ्यमधिकारो दीयते किन्वन्ये यथा दृष्ट्वापि न पश्यन्ति श्रुत्वापि म
 बुध्यन्ते य तदर्थं तेषां पुरस्तात् ताः सर्वाः कथा दृष्टान्तेन कथ्यन्ते। 11
 दृष्टान्तस्यास्याभिप्रायः, ईश्वरीयकथा बीजस्वरूपा। 12 ये कथामात्रं
 शृण्वन्ति किन्तु पश्चाद् विश्वस्य यथा परित्राणं न प्राप्नुवन्ति तदाशयेन
 शैतानेत्य हृदयात् तां कथाम् अपहरति त अेव मार्गपार्श्वस्थभूमिस्वरूपाः।
 13 ये कथं श्रुत्वा सानन्दं गृह्णन्ति किन्वबद्धमूलत्वात् स्वल्पकालमात्रं प्रतीत्य
 परीक्षाकाले ब्रश्यन्ति तअेव पाषाणभूमिस्वरूपाः। 14 ये कथां श्रुत्वा
 यान्ति विषययिन्तायां धनलोभेन अेडिकसुभे य मज्जन्त उपयुक्तइलानि
 न इलन्ति त अेवोप्तबीजकण्टकिभूस्वरूपाः। 15 किन्तु ये श्रुत्वा सरलैः
 शुद्धैश्चान्तःकरणैः कथां गृह्णन्ति धैर्यम् अवलम्ब्य इलान्युत्पादयन्ति य
 त अेवोत्तमभूत्स्वरूपाः। 16 अपरञ्च प्रदीपं प्रज्वाल्य कोपि पात्रेण
 नाच्छादयति तथा अद्वाधोपि न स्थापयति, किन्तु दीपाधारोपर्येव स्थापयति,
 तस्मात् प्रवेशका दीप्तिं पश्यन्ति। 17 यन्न प्रकाशयिष्यते तादृग् अप्रकाशितं
 वस्तु किमपि नास्ति यच्च न सुव्यक्तं प्रचारयिष्यते तादृग् गृप्तं वस्तु किमपि
 नास्ति। 18 अतो यूयं केन प्रकारेण शृणुथ तत्र सावधाना भवत, यस्य
 समीपे बद्धते तस्मै पुनर्दास्यते किन्तु यस्याश्रये न बद्धते तस्य यधदस्ति

तदपि तस्मात् नेष्यते | 19 अपरञ्च यीशो माता भ्रातरश्च तस्य समीपं
 जिगमिषवः 20 किन्तु जनतासम्भाधात् तत्सन्निधिं प्राप्तुं न शक्नुः | तत्पश्चात्
 तव माता भ्रातरश्च त्वां साक्षात् सिद्धीर्षन्तो बहिस्तिष्ठन्तीति वार्तायां तस्मै
 कथितायां 21 स प्रत्युवाच; ये जना इश्वरस्य कथां श्रुत्वा तदनुत्पमायरन्ति
 तथैव मम माता भ्रातरश्च | 22 अनन्तरं अकदा यीशुः शिष्यैः सार्द्धं
 नावमारुह्य जगात्, आयात वयं हृदस्य पारं यामः, ततस्ते जग्मुः | 23 तेषु
 नौकां वाडयत्सु स निदद्रौ; 24 अथाकस्मात् प्रबलजग्त्भगमाद् हृदे नौकायां
 तरङ्गैराच्छन्नायां विपत् तान् जग्रास | तस्माद् यीशोरन्तिकं गत्वा हे गुरो हे
 गुरो प्राणा नो यान्तीति गदित्वा तं जागरयाम्बभूवुः | तदा स उत्थाय वायुं
 तरङ्गांश्च तर्जयामास तस्माद्गुणैः निवृत्य स्थिरौ बभूवतुः | 25 स तान्
 बभाषे युष्माकं विश्वासः क? तस्मात्ते भीता विस्मिताश्च परस्परं जगदुः,
 अहो कीदृशं मनुजः पवनं पानीयञ्चादिशति तद्गुणं तदादेशं वदति |
 26 ततः परं गालीलप्रदेशस्य सम्मुषस्थगिदेरीयप्रदेशे नौकायां लग्न्यां
 तटेऽवरोहमावाद् 27 बहुतिथकालं भूतग्रस्त एको मानुषः पुरादागत्य तं
 साक्षाद्यकार | स मनुषो वासो न परिदधत् गृहे य न वसन् केवलं श्मशानम्
 अध्युवास | 28 स यीशुं दृष्ट्वा यीशुश्च ब्रूयत् यकार तस्य सम्मुषे पतित्वा
 प्रोच्यैर्जगात् य, हे सर्वप्रधानेश्वरस्य पुत्र, मया सद्य तव कः सम्बन्धः?
 त्वयि विनयं करोमि मां मा यातय | 29 यतः स तं मानुषं त्यक्त्वा यातुम्
 अमेध्यभूतम् आदिदेश; स भूतस्तं मानुषम् असकृद् एधार तस्मात्ल्लोकाः
 शृङ्खलेन निगडेन य अबन्धुः; स तद् भंक्त्वा भूतवशत्वात् मध्येप्रान्तरं
 ययौ | 30 अनन्तरं यीशुस्तं पप्रच्छ तव किन्नाम? स उवाच, मम नाम
 बाहिनो यतो बहवो भूतास्तमाशिश्रियुः | 31 अथ भूता विनयेन जगदुः,
 गभीरं गर्तं गन्तुं माझापयास्मान् | (Abyssos g12) 32 तदा पर्वतोपरि
 वराड्रजश्चरति तस्माद् भूता विनयेन प्रोयुः, अमुं वराड्रजम् आश्रयितुम्
 अस्मान् अनुजानीहि; ततः सोनुजङ्गौ | 33 ततः परं भूतास्तं मानुषं विहाय
 वराड्रजम् आशिश्रियुः वराड्रजश्च तत्क्षणात् कटकेन धावन्तो हृदे
 प्राणान् विजृम्भुः | 34 तद् दृष्ट्वा शूकरक्षकाः पलायमाना नगरं ग्रामञ्च गत्वा
 तत्सर्व्ववृत्तान्तं कथयामासुः | 35 ततः किं वृत्तम् अतद्दर्शनार्थं लोका निर्गत्य
 यीशोः समीपं ययुः, तं मानुषं त्यक्तभूतं परिहितवस्त्रं स्वस्थमानुषवद्

યીશોશ્રારણસન્નિઘૌ સૂપવિશન્તં વિલોક્ય બિભ્યુઃ | 36 યે લોકાસ્તસ્ય
 ભૂતગ્રસ્તસ્ય સ્વાસ્થ્યકરણં દદૃશુસ્તે તેભ્યઃ સર્વવૃત્તાન્તં કથયામાસુઃ |
 37 તદનન્તરં તસ્ય ગિદેરીયપ્રદેશસ્ય ચતુર્દિકસ્થા બહવો જના અતિત્રસ્તા
 વિનયેન તં જગદુઃ, ભવાન્ અસ્માકં નિકટાદ્ પ્રજતુ તસ્માત્ સ નાવમારુઘ
 તતો વ્યાઘુત્ય જગામ | 38 તદાનીં ત્યક્તભૂતમનુજસ્તેન સહ સ્થાતું
 પ્રાર્થયાઞ્ચકે 39 કિન્તુ તદર્થમ્ ઇશ્વરઃ કીદક્ષ્ણહાકર્મ્મ કૃતવાન્ ઇતિ નિવેશનં
 ગત્વા વિજ્ઞાપય, યીશુઃ કથામેતાં કથયિત્વા તં વિસસર્જ | તતઃ સ વ્રજિત્વા
 યીશુસ્તદર્થ યન્મહાકર્મ્મ ચકાર તત્ પુરસ્ય સર્વત્ર પ્રકાશયિતું પ્રારેભે |
 40 અથ યીશૌ પરાવૃત્યાગતે લોકાસ્તં આદરેણ જગૃહુ યસ્માત્તે સર્વે
 તમપેક્ષાઞ્ચકિરે | 41 તદનન્તરં યાચીનામ્નો ભજનગેહસ્યૈકોઘિપ આગત્ય
 યીશોશ્રારણયોઃ પતિત્વા સ્વનિવેશનાગમનાર્થ તસ્મિન્ વિનયં ચકાર, 42
 ચતસ્તસ્ય દ્વાદશવર્ષવયસ્કા કન્યૈકાસીત્ સા મૃતકલ્પાભવત્ | તતસ્તસ્ય
 ગમનકાલે માર્ગે લોકાનાં મહાન્ સમાગમો બભૂવ | 43 દ્વાદશવર્ષાણિ
 પ્રદરોગગ્રસ્તા નાના વૈઘૈશ્ચિકિત્સિતા સર્વસ્વં વ્યયિત્વાપિ સ્વાસ્થ્યં ન
 પ્રાપ્તા યા યોષિત્ સા યીશોઃ પશ્ચાદાગત્ય તસ્ય વસ્ત્રગ્રન્થિં પસ્પર્શ |
 44 તસ્માત્ તત્ક્ષણાત્ તસ્યા રક્તસ્રાવો રુદ્ધઃ | 45 તદાનીં યીશુરવદત્
 કેનાહં સ્પૃષ્ટઃ? તતોડનેકૈરનઙ્ગીકૃતે પિતરસ્તસ્ય સઙ્ગિનશ્રાવદન, હે ગુરો
 લોકા નિકટસ્થાઃ સન્તસ્તવ દેહે ઘર્ષયન્તિ, તથાપિ કેનાહં સ્પૃષ્ટઇતિ ભવાન્
 કુતઃ સ્પૃષ્ટઇતિ? 46 યીશુઃ કથયામાસ, કેનાપ્યહં સ્પૃષ્ટો, યતો મતઃ શક્તિ
 નિર્ગતેતિ મયા નિશ્ચિતમજ્ઞાયિ | 47 તદા સા નારી સ્વયં ન ગુપ્તેતિ વિદિત્વા
 કમ્પમાના સતી તસ્ય સમ્મુખે પપાત; યેન નિમિત્તેન તં પસ્પર્શ સ્પર્શમાત્રાય્ય
 યેન પ્રકારેણ સ્વસ્થાભવત્ તત્ સર્વં તસ્ય સાક્ષાદાયખ્યૌ | 48 તતઃ સ
 તાં જગાદ હે કન્યે સુસ્થિરા ભવ, તવ વિશ્વાસસ્ત્વાં સ્વસ્થામ્ અકાર્ષીત્
 ત્વં ક્ષેમેણ યાહિ | 49 યીશોરેતદ્વાક્યવદનકાલે તસ્યાઘિપતે નિવેશનાત્
 કશ્ચિલ્લોક આગત્ય તં બભાષે, તવ કન્યા મૃતા ગુરું મા ક્લિશાન | 50 કિન્તુ
 યીશુસ્તદાકણ્યાઘિપતિં વ્યાજહાર, મા ભૈષીઃ કેવલં વિશ્વસિહિ તસ્માત્
 સા જીવિષ્યતિ | 51 અથ તસ્ય નિવેશને પ્રાપ્તે સ પિતરં યોહનં યાકૂબઞ્ચ
 કન્યાયા માતરં પિતરઞ્ચ વિના, અન્યં કઞ્ચન પ્રવેષ્ટું વારયામાસ | 52 અપરઞ્ચ
 યે રુદન્તિ વિલપન્તિ ચ તાન્ સર્વાન્ જનાન્ ઉવાચ, યૂયં મા રોદિષ્ટ કન્યા ન

મૃતા નિદ્રાતિ | 53 કિન્તુ સા નિશ્ચિતં મૃતેતિ જ્ઞાત્વા તે તમુપજહસુઃ | 54
 પશ્ચાત્ સ સર્વાન્ બહિઃ કૃત્વા કન્યાયાઃ કરૌ ધૃત્વાજુહુવે, હે કન્યે ત્વમુત્તિષ્ઠ,
 55 તસ્માત્ તસ્યાઃ પ્રાણેષુ પુનરાગતેષુ સા તત્ક્ષણાદ્ ઉત્તસ્યૌ | તદાનીં તસ્યૈ
 કિન્ચિદ્ ભક્ષ્યં દાતુમ્ આદિદેશ | 56 તતસ્તસ્યાઃ પિતરૌ વિસ્મયં ગતૌ કિન્તુ
 સ તાવાદિદેશ ઘટનાયા એતસ્યાઃ કથાં કર્મૈચિદપિ મા કથયતં |

9 તતઃ પરં સ દ્વાદશશિષ્યાનાહૂય ભૂતાન્ ત્યાજયિતું રોગાન્ પ્રતિકર્તુઞ્ચ
 તેભ્યઃ શક્તિમાધિપત્યઞ્ચ દદૌ | 2 અપરઞ્ચ ઈશ્વરીયરાજ્યસ્ય સુસંવાદં
 પ્રકાશયિતુમ્ રોગિણામારોગ્યં કર્તુઞ્ચ પ્રેરણકાલે તાન્ જગાદ | 3 યાત્રાર્થં
 યષ્ટિ વસ્ત્રપુટકં ભક્ષ્યં મુદ્રા દ્વિતીયવસ્ત્રમ્, એષાં કિમપિ મા ગૃહ્ણીત | 4
 યૂયઞ્ચ યન્નિવેશનં પ્રવિશથ નગરત્યાગપર્યનતં તન્નિવેશને તિષ્ઠત | 5 તત્ર
 યદિ કસ્યચિત્ પુરસ્ય લોકા યુષ્માકમાતિથ્યં ન કુર્વન્તિ તર્હિ તસ્માન્નગરાદ્
 ગમનકાલે તેષાં વિરુદ્ધં સાક્ષ્યાર્થં યુષ્માકં પદધૂલીઃ સમ્પાતયત | 6
 અથ તે પ્રસ્થાય સર્વત્ર સુસંવાદં પ્રચારયિતું પીડિતાન્ સ્વસ્થાન્ કર્તુઞ્ચ
 ગ્રામેષુ ભ્રમિતું પ્રારેભિરે | 7 એતર્હિ હેરોદ્ રાજા યીશોઃ સર્વકર્મ્મણાં
 વાર્તાં શ્રુત્વા ભૃશમુદ્ધિવિજે 8 યતઃ કેચિદ્દૂયુર્યોહન્ શ્મશાનાદુદતિષ્ઠત્ |
 કેચિદ્દૂયુઃ, એલિયો દર્શનં દત્તવાન્; એવમન્યલોકા ઊચુઃ પૂર્વીયઃ કશ્ચિદ્
 ભવિષ્યદ્વાદી સમુત્થિતઃ | 9 કિન્તુ હેરોદુવાય યોહનઃ શિરોહમ્છિનદમ્
 ઇદાનીં યસ્યેદ્કર્મ્મણાં વાર્તાં પ્રાપ્નોમિ સ કઃ? અથ સ તં દ્રષ્ટુમ્ ઐચ્છત્ |
 10 અનન્તરં પ્રેરિતાઃ પ્રત્યાગત્ય યાનિ યાનિ કર્મ્મણિ ચક્રુસ્તાનિ યીશવે
 કથયામાસુઃ તતઃ સ તાન્ બૈત્સૈદાનામકનગરસ્ય વિજનં સ્થાનં નીત્વા ગુપ્તં
 જગામ | 11 પશ્ચાલ્ લોકાસ્તદ્ વિદિત્વા તસ્ય પશ્ચાદ્ યયુઃ; તતઃ સ તાન્ નયન્
 ઈશ્વરીયરાજ્યસ્ય પ્રસન્નમુક્તવાન્, યેષાં ચિકિત્સયા પ્રયોજનમ્ આસીત્
 તાન્ સ્વસ્થાન્ ચકાર ચ | 12 અપરઞ્ચ દિવાવસન્ને સતિ દ્વાદશશિષ્યા
 યીશોરન્તિકમ્ એત્ય કથયામાસુઃ, વયમત્ર પ્રાન્તરસ્થાને તિષ્ઠામઃ, તતો
 નગરાણિ ગ્રામાણિ ગત્વા વાસસ્થાનાનિ પ્રાપ્ય ભક્ષ્યદ્રવ્યાણિ કેતું જનનિવહં
 ભવાન્ વિસૃજતુ | 13 તદા સ ઉવાચ, યૂયમેવ તાન્ ભેજયધ્વં; તતસ્તે
 પ્રોચુરસ્માકં નિકટે કેવલં પઞ્ચ પૂષા દ્વૌ મત્સ્યૌ ચ વિધન્તે, અતએવ
 સ્થાનાન્તરમ્ ઇત્વા નિમિત્તમેતેષાં ભક્ષ્યદ્રવ્યેષુ ન કીતેષુ ન ભવતિ | 14
 તત્ર પ્રાયેણ પઞ્ચસહસ્રાણિ પુરુષા આસન્ | 15 તદા સ શિષ્યાન્ જગાદ

પઞ્ચાશત્ પઞ્ચાશજ્જનૈઃ પંક્તીકૃત્ય તાનુપવેશયત, તસ્માત્ તે તદનુસારેણ
 સર્વલોકાનુપવેશયાપાસુઃ | 16 તતઃ સ તાન્ પઞ્ચ પૂપાન્ મીનદ્વયઞ્ચ ગૃહીત્વા
 સ્વર્ગં વિલોક્યેશ્વરગુણાન્ કીર્તયાઞ્ચક્રે ભઙ્કતા ચ લોકેભ્યઃ પરિવેષણાર્થં
 શિષ્યેષુ સમર્પયામ્બભૂવ | 17 તતઃ સર્વે ભુક્ત્વા તૃપ્તિં ગતા અવશિષ્ટાનાઞ્ચ
 દ્વાદશ ડલ્લકાન્ સંજગુહુઃ | 18 અથૈકદા નિર્જને શિષ્યૈઃ સહ પ્રાર્થનાકાલે
 તાન્ પપ્રચ્છ, લોકા માં કં વદન્તિ? 19 તતસ્તે પ્રાયુઃ, ત્વાં ચોહન્મજ્જકં
 વદન્તિ; કેચિત્ ત્વામ્ એલિયં વદન્તિ, પૂર્વકાલિકઃ કશ્ચિદ્ ભવિષ્યદ્વાદી
 શ્મશાનાદ્ ઉદતિષ્ઠદ્ ઇત્યપિ કેચિદ્ વદન્તિ | 20 તદા સ ઉવાચ, યૂયં માં કં
 વદથ? તતઃ પિતર ઉક્તવાન્ ત્વમ્ ઇશ્વરાભિષિક્તઃ પુરુષઃ | 21 તદા સ
 તાન્ દૃઢમાદિદેશ, કથામેતાં કર્મૈચિદપિ મા કથયત | 22 સ પુનરુવાચ,
 મનુષ્યપુત્રેણ વહુયાતના ભોક્તવ્યાઃ પ્રાચીનલોકૈઃ પ્રધાનયાજકૈરધ્યાપકૈશ્ચ
 સોવજ્ઞાય હન્તવ્યઃ કિન્તુ તૃતીયદિવસે શ્મશાનાત્ તેનોત્થાતવ્યમ્ | 23
 અપરં સ સર્વાનુવાચ, કશ્ચિદ્ યદિ મમ પશ્ચાદ્ ગન્તું વાઞ્છતિ તર્હિ સ સ્વં
 દામ્યતુ, દિને દિને કુશં ગૃહીત્વા ચ મમ પશ્ચાદાગચ્છતુ | 24 યતો યઃ કશ્ચિત્
 સ્વપ્રાણાન્ રિરક્ષિષ્યતિ સ તાન્ હારયિષ્યતિ, યઃ કશ્ચિન્ મદર્થં પ્રાણાન્
 હારયિષ્યતિ સ તાન્ રક્ષિષ્યતિ | 25 કશ્ચિદ્ યદિ સર્વં જગત્ પ્રાપ્નોતિ
 કિન્તુ સ્વપ્રાણાન્ હારયતિ સ્વયં વિનશ્યતિ ચ તર્હિ તસ્ય કો લાભઃ? 26 પુન
 ર્થઃ કશ્ચિન્ માં મમ વાક્યં વા લજ્જાસ્પદં જાનાતિ મનુષ્યપુત્રો યદા સ્વસ્ય
 પિતુશ્ચ પવિત્રાણાં દૂતાનાઞ્ચ તેજોભિઃ પરિવેષિત આગમિષ્યતિ તદા સોપિ તં
 લજ્જાસ્પદં જ્ઞાસ્યતિ | 27 કિન્તુ યુષ્માનહં યથાર્થં વદામિ, ઇશ્વરીયરાજત્વં
 ન દૃષ્ટવા મૃત્યું નાસ્વાદિષ્યન્તે, એતાદૃશાઃ કિયન્તો લોકા અત્ર સ્થનેડપિ
 દણ્ડાયમાનાઃ સન્તિ | 28 એતદાખ્યાનકથનાત્ પરં પ્રાયેણાષ્ટસુ દિનેષુ ગતેષુ
 સ પિતરં ચોહનં યાકૂબઞ્ચ ગૃહીત્વા પ્રાર્થયિતું પર્વતમેકં સમારુરોહ | 29 અથ
 તસ્ય પ્રાર્થનકાલે તસ્ય મુખાકૃતિરન્યરૂપા જાતા, તદીયં વસ્ત્રમુજ્જવલશુક્લં
 જાતં | 30 અપરઞ્ચ મૂસા એલિયશ્ચોભૌ તેજસ્વિનૌ દૃષ્ટૌ 31 તૌ તેન
 યિરૂશાલમ્પુરે ચો મૃત્યુઃ સાધિષ્યતે તદીયાં કથાં તેન સાદ્ધ્વં કથયિતુમ્
 આરેભાતે | 32 તદા પિતરાદયઃ સ્વસ્ય સક્તિનો નિદ્રયાકૃષ્ટા આસન્ કિન્તુ
 જાગરિત્વા તસ્ય તેજસ્તેન સાદ્ધ્વમ્ ઉત્તિષ્ઠન્તૌ જનૌ ચ દદૃશુઃ | 33 અથ
 તયોરુભયો ગર્ભનકાલે પિતરો યીશું બભાષે, હે ગુરોડસ્માકં સ્થાનેડસ્મિન્

સ્થિતિઃ શુભા, તત એકા ત્વદર્થા, એકા મૂસાર્થા, એકા એલિયાર્થા, ઇતિ
તિસ્રઃ કુટ્યોસ્માભિર્નિર્માયન્તાં, ઇમાં કથાં સ ન વિવિચ્ય કથયામાસ | 34
અપરઞ્ચ તદ્વાક્યવદનકાલે પયોદ એક આગત્ય તેષામુપરિ છાયાં ચકાર,
તતસ્તન્મધ્યે તયોઃ પ્રવેશાત્ તે શશક્રિરે | 35 તદા તસ્માત્ પયોદાદ્
ઇયમાકાશીયા વાણી નિર્જગામ, મમાયં પ્રિયઃ પુત્ર એતસ્ય કથાયાં મનો
નિધત્ | 36 ઇતિ શબ્દે જાતે તે યીશુમેકાકિનં દદૃશુઃ કિન્તુ તે તદાનીં તસ્ય
દર્શનસ્ય વાયમેકામપિ નોક્ત્વા મનઃસુ સ્થાપયામાસુઃ | 37 પરેડહનિ તેષુ
તસ્માચ્છૈલાદ્ અવરૂઢેષુ તં સાક્ષાત્ કર્તુ બહવો લોકા આજગમુઃ | 38 તેષાં
મધ્યાદ્ એકો જન ઉચ્ચૈરુવાચ, હે ગુરો અહં વિનયં કરોમિ મમ પુત્રં પ્રતિ
કૃપાદૃષ્ટિં કરોતુ, મમ સ એવૈકઃ પુત્રઃ | 39 ભૂતેન ધૃતઃ સન્ સં પ્રસભં યીચ્છબ્દં
કરોતિ તન્મુખાત્ ફેણા નિર્ગચ્છન્તિ ચ, ભૂત ઇત્યં વિદાર્ય ક્લિષ્ટ્વા પ્રાયશસ્તં
ન ત્યજતિ | 40 તસ્માત્ તં ભૂતં ત્યાજયિતું તવ શિષ્યસમીપે ન્યવેદયં
કિન્તુ તે ન શેકુઃ | 41 તદા યીશુરવાદીત્, રે આવિશ્વાસિન્ વિપથગામિન્
વંશ કતિકાલાન્ યુષ્માભિઃ સહ સ્થાસ્યામ્યહં યુષ્માકમ્ આચરણાનિ ચ
સહિષ્યે? તવ પુત્રમિહાનય | 42 તતસ્તસ્મિન્નાગતમાત્રે ભૂતસ્તં ભૂમૌ
પાતયિત્વા વિદદાર; તદા યીશુસ્તમમેધ્યં ભૂતં તર્જયિત્વા બાલકં સ્વસ્થં
કૃત્વા તસ્ય પિતરિ સમર્પયામાસ | 43 ઈશ્વરસ્ય મહાશક્તિમ્ ઇમાં
વિલોક્ય સર્વે ચમચ્ચકુઃ; ઇત્યં યીશોઃ સર્વાભિઃ ક્રિયાભિઃ સર્વેલોકૈરાશ્ચર્યે
મન્યમાને સતિ સ શિષ્યાન્ બભાષે, 44 કથેયં યુષ્માકં કર્ણેષુ પ્રવિશતુ,
મનુષ્યપુત્રો મનુષ્યાણાં કરેષુ સમર્પયિષ્યતે | 45 કિન્તુ તે તાં કથાં ન
બુબુધિરે, સ્પષ્ટવાભાવાત્ તસ્યા અભિપ્રાયસ્તેષાં બોધગમ્યો ન બભૂવ;
તસ્યા આશયઃ ક ઇત્યપિ તે ભયાત્ પ્રષ્ટું ન શેકુઃ | 46 તદનન્તરં તેષાં મધ્યે
કઃ શ્રેષ્ઠઃ કથામેતાં ગૃહીત્વા તે મિથો વિવાદં ચક્રુઃ | 47 તતો યીશુસ્તેષાં
મનોભિપ્રાયં વિદિત્વા બાલકમેકં ગૃહીત્વા સ્વસ્ય નિકટે સ્થાપયિત્વા
તાન્ જગાદ, 48 યો જનો મમ નામ્નાસ્ય બાલાસ્યાતિથ્યં વિદદાતિ સ
મમાતિથ્યં વિદદાતિ, ચશ્ચ મમાતિથ્યં વિદદાતિ સ મમ પ્રેરકસ્યાતિથ્યં
વિદદાતિ, યુષ્માકં મધ્યેયઃ સ્વં સર્વસ્માત્ ક્ષુદ્રં જાનીતે સ એવ શ્રેષ્ઠો
ભવિષ્યતિ | 49 અપરઞ્ચ યોહન્ વ્યાજહાર હે પ્રભે તવ નામ્ના ભૂતાન્
ત્યાજયન્તં માનુષમ્ એકં દૃષ્ટવન્તો વયં, કિન્ત્વસ્માકમ્ અપશ્રાદ્ ગામિત્વાત્

તં ન્યષેધામ્ | તદાનીં યીશુરુવાય, 50 તં મા નિષેધત, યતો યો જનોસ્માકં ન
 વિપક્ષઃ સ એવાસ્માકં સપક્ષો ભવતિ | 51 અનન્તરં તસ્યારોહણસમય
 ઉપસ્થિતે સ સ્થિરચેતા ચિરૂશાલમં પ્રતિ યાત્રાં કર્તું નિશ્ચિત્યાત્રે દૂતાન્
 પ્રેષયામાસ | 52 તસ્માત્ તે ગત્વા તસ્ય પ્રયોજનીયદ્રવ્યાણિ સંગ્રહીતું
 શોભિરોણીયાનાં ગ્રામં પ્રવિવિશુઃ | 53 કિન્તુ સ ચિરૂશાલમં નગરં યાતિ
 તતો હેતો લોકાસ્તસ્યાતિથ્યં ન ચક્રુઃ | 54 અતએવ યાકૂબ્યોહનૌ તસ્ય
 શિષ્યૌ તદ્ દૃષ્ટ્વા જગદતુઃ, હે પ્રભો એલિયો યથા ચકાર તથા વયમપિ
 કિં ગગણાદ્ આગન્તુમ્ એતાન્ ભસ્મીકર્તુઞ્ચ વહ્નિમાજ્ઞાપયામઃ? ભવાન્
 કિમિચ્છતિ? 55 કિન્તુ સ મુખં પરાવર્ત્ય તાન્ તર્જયિત્વા ગદિતવાન્ યુષ્માકં
 મનોભાવઃ કઃ, ઇતિ યૂયં ન જાનીથ | 56 મનુજસુતો મનુજાનાં પ્રાણાન્
 નાશયિતું નાગચ્છત્, કિન્તુ રક્ષિતુમ્ આગચ્છત્ | પશ્ચાદ્ ઇતરગ્રામં તે યયુઃ |
 57 તદનન્તરં પથિ ગમનકાલે જન એકસ્તં બભાષે, હે પ્રભો ભવાન્ યત્ર યાતિ
 ભવતા સહાહમપિ તત્ર યાસ્યામિ | 58 તદાનીં યીશુસ્તમુવાય, ગોમાયૂનાં
 ગર્તા આસતે, વિહાયસીયવિહગાનાં નીડાનિ ચ સન્તિ, કિન્તુ માનવતનયસ્ય
 શિરઃ સ્થાપયિતું સ્થાનં નાસ્તિ | 59 તતઃ પરં સ ઇતરજનં જગાદ, ત્વં મમ
 પશ્ચાદ્ એહિઃ તતઃ સ ઉવાચ, હે પ્રભો પૂર્વં પિતરં શ્મશાને સ્થાપયિતું
 મામાદિશતુ | 60 તદા યીશુરુવાય, મૃતા મૃતાન્ શ્મશાને સ્થાપયન્તુ કિન્તુ
 ત્વં ગત્વેશ્વરીયરાજ્યસ્ય કથાં પ્રચારય | 61 તતોન્યઃ કથયામાસ, હે પ્રભો
 મયાપિ ભવતઃ પશ્ચાદ્ ગંસ્યતે, કિન્તુ પૂર્વં મમ નિવેશનસ્ય પરિજનાનામ્
 અનુમતિં ગ્રહીતુમ્ અહમાદિશ્યૈ ભવતા | 62 તદાનીં યીશુસ્તં પ્રોકતવાન્, યો
 જનો લાઙ્ગલે કરમર્પયિત્વા પશ્ચાત્ પશ્યતિ સ ઇશ્વરીયરાજ્યં નાર્હતિ |

10 તતઃ પરં પ્રભુરપરાન્ સપ્તતિશિષ્યાન્ નિયુજ્ય સ્વયં યાનિ નગરાણિ
 યાનિ સ્થાનાનિ ચ ગમિષ્યતિ તાનિ નગરાણિ તાનિ સ્થાનાનિ ચ પ્રતિ દ્વૌ
 દ્વૌ જનૌ પ્રહિતવાન્ | 2 તેભ્યઃ કથયામાસ ચ શસ્યાનિ બહૂનીતિ સત્યં
 કિન્તુ છેદકા અલ્પે; તસ્માદ્દેતોઃ શસ્યક્ષેત્રે છેદકાન્ અપરાનપિ પ્રેષયિતું
 ક્ષેત્રસ્વામિનં પ્રાર્થયધ્વં | 3 યૂયં યાત, પશ્યત, વૃકાણાં મધ્યે મેષશાવકાનિવ
 યુષ્માન્ પ્રહિણોમિ | 4 યૂયં ક્ષુદ્રં મહદ્ વા વસનસમ્પુટકં પાદુકાશ્ચ મા ગૃહ્ણીત,
 માર્ગમધ્યે કમપિ મા નમત ચ | 5 અપરઞ્ચ યૂયં યદ્ યત્ નિવેશનં પ્રવિશથ
 તત્ર નિવેશનસ્યાસ્ય મજ્જલં ભૂયાદિતિ વાક્યં પ્રથમં વદત | 6 તસ્માત્ તસ્મિન્

નિવેશને યદિ મજ્જલપાત્રં સ્થાસ્યતિ તર્હિ તન્મજ્જલં તસ્ય ભવિષ્યતિ, નોચેત્
 યુષ્માન્ પ્રતિ પરાવર્તિષ્યતે | 7 અપરઞ્ચ તે યત્કિઞ્ચિદ્ દાસ્યન્તિ તદેવ
 ભુક્ત્વા પીત્વા તસ્મિન્નિવેશને સ્થાસ્યથ; યતઃ કર્મકારી જનો ભૃતિમ્
 અર્હતિ; ગૃહાદ્ ગૃહં મા યાસ્યથ | 8 અન્યચ્ચ યુષ્માસુ કિમપિ નગરં પ્રવિષ્ટેષુ
 લોકા યદિ યુષ્માકમ્ આતિથ્યં કરિષ્યન્તિ, તર્હિ યત્ ખાધમ્ ઉપસ્થાસ્યન્તિ
 તદેવ ખાદિષ્યથ | 9 તન્નગરસ્થાન્ રોગિણઃ સ્વસ્થાન્ કરિષ્યથ, ઈશ્વરીયં
 રાજ્યં યુષ્માકમ્ અન્તિકમ્ આગમત્ કથામેતાઞ્ચ પ્રચારયિષ્યથ | 10
 કિન્તુ કિમપિ પુરં યુષ્માસુ પ્રવિષ્ટેષુ લોકા યદિ યુષ્માકમ્ આતિથ્યં ન
 કરિષ્યન્તિ, તર્હિ તસ્ય નગરસ્ય પન્થાનં ગત્વા કથામેતાં વદિષ્યથ, 11 યુષ્માકં
 નગરીયા યા ધૂલ્યોડસ્માસુ સમલગન્ તા અપિ યુષ્માકં પ્રાતિકૂલ્યેન સાક્ષ્યાર્થં
 સમ્પાતયામઃ; તથાપીશ્વરરાજ્યં યુષ્માકં સમીપમ્ આગતમ્ ઇતિ નિશ્ચિતં
 જાનીત | 12 અહં યુષ્મભ્યં યથાર્થં કથયામિ, વિચારદિને તસ્ય નગરસ્ય
 દશાતઃ સિદોમો દશા સહ્યા ભવિષ્યતિ | 13 હા હા કોરાસીન્ નગર, હા હા
 બૈત્સૈદાનગર યુવચોર્મધ્યે યાદૃશાનિ આશ્ચર્યાણિ કર્મ્માણ્યક્રિયન્ત, તાનિ
 કર્મ્માણિ યદિ સોરસીદોનો નગરયોરકારિષ્યન્ત, તદા ઇતો બહુદિનપૂર્વ્યં
 તન્નિવાસિનઃ શાણવસ્ત્રાણિ પરિધાય ગાત્રેષુ ભસ્મ વિલિપ્ય સમુપવિશ્ય
 સમખેત્સ્યન્ત | 14 અતો વિચારદિવસે યુષ્માકં દશાતઃ સોરસીદોન્નિવાસિનાં
 દશા સહ્યા ભવિષ્યતિ | 15 હે કફ્નાહૂમ્, ત્વં સ્વર્ગં યાવદ્ ઉન્નતા કિન્તુ
 નરકં યાવત્ ન્યગભવિષ્યસિ | (Madēs 986) 16 યો જનો યુષ્માકં વાક્યં
 ગૃહ્ણાતિ સ મમૈવ વાક્યં ગૃહ્ણાતિ; કિઞ્ચ યો જનો યુષ્માકમ્ અવજ્ઞાં કરોતિ સ
 મમૈવાવજ્ઞાં કરોતિ; યો જનો મમાવજ્ઞાં કરોતિ ચ સ મત્પ્રેરકસ્યૈવાવજ્ઞાં
 કરોતિ | 17 અથ તે સપ્તતિશિષ્યા આનન્દેન પ્રત્યાગત્ય કથયામાસુ; હે
 પ્રભો ભવતો નામ્ના ભૂતા અપ્યસ્માકં વશીભવન્તિ | 18 તદાનીં સ તાન્
 જગાદ, વિધુતમિવ સ્વર્ગાત્ પતન્તં શૈતાનમ્ અદર્શમ્ | 19 પશ્યત સર્પાન્
 વૃશ્ચિકાન્ રિપોઃ સર્વપરાક્રમાંશ્ચ પદતલૈ દલયિતું યુષ્મભ્યં શક્તિં દદામિ
 તસ્માદ્ યુષ્માકં કાપિ હાનિ ન ભવિષ્યતિ | 20 ભૂતા યુષ્માકં વશીભવન્તિ,
 એતન્નિમિત્તત્ મા સમુલ્લસત, સ્વર્ગે યુષ્માકં નામાનિ લિખિતાનિ સન્તીતિ
 નિમિત્તં સમુલ્લસત | 21 તદ્દટિકાયાં યીશુ મનસિ જાતાહ્વાદઃ કથયામાસ હે
 સ્વર્ગપૃથિવ્યોરેકાધિપતે પિતસ્ત્વં જ્ઞાનવતાં વિદુષાઞ્ચ લોકાનાં પુરસ્તાત્

સર્વમેતદ્ અપ્રકાશ્ય બાલકાનાં પુરસ્તાત્ પ્રાકાશય એતસ્માદ્દેતોસ્ત્વાં ધન્યં
 વદામિ, હે પિતરિત્થં ભવતુ યદ્ એતદેવ તવ ગોચર ઉત્તમમ્ | 22 પિત્રા
 સર્વાણિ મયિ સમર્પિતાનિ પિતરં વિના કોપિ પુત્રં ન જાનાતિ કિંચ પુત્રં
 વિના યસ્મૈ જનાય પુત્રસ્તં પ્રકાશિતવાન્ તન્ન વિના કોપિ પિતરં ન જાનાતિ |
 23 તપઃ પરં સ શિષ્યાન્ પ્રતિ પરાવૃત્ય ગુપ્તં જગાદ, યૂયમેતાનિ સર્વાણિ
 પશ્યથ તતો યુષ્માકં ચક્ષૂંષિ ધન્યાનિ | 24 યુષ્માનહં વદામિ, યૂયં યાનિ
 સર્વાણિ પશ્યથ તાનિ બહવો ભવિષ્યદ્વાદિનો ભૂપતયશ્ચ દ્રષ્ટુમિચ્છન્તોપિ
 દ્રષ્ટું ન પ્રાપ્નુવન્, યુષ્માભિ ર્યા યાઃ કથાશ્ચ શ્રૂયન્તે તાઃ શ્રોતુમિચ્છન્તોપિ
 શ્રોતું નાલભન્ત | 25 અનન્તરમ્ એકો વ્યવસ્થાપક ઉત્થાય તં પરીક્ષિતું
 પપ્રચ્છ, હે ઉપદેશક અનન્તાયુષઃ પ્રાપ્તયે મયા કિં કરણીયં? (aiōnios
 g166) 26 યીશુઃ પ્રત્યુવાય, અત્રાર્થે વ્યવસ્થાયાં કિં લિખિતમસ્તિ? ત્વં કીદૃક્
 પઠસિ? 27 તતઃ સોવદત્, ત્વં સર્વાન્તઃકરણૈઃ સર્વપ્રાણૈઃ સર્વશક્તિભિઃ
 સર્વચિત્તૈશ્ચ પ્રભૌ પરમેશ્વરે પ્રેમ કુરુ, સમીપવાસિનિ સ્વવત્ પ્રેમ કુરુ
 ચ | 28 તદા સ કથયામાસ, ત્વં યથાર્થં પ્રત્યવોચઃ, ઇત્થમ્ આચર તેનૈવ
 જીવિષ્યસિ | 29 કિન્તુ સ જનઃ સ્વં નિર્દોષં જ્ઞાપયિતું યીશું પપ્રચ્છ, મમ
 સમીપવાસી કઃ? તતો યીશુઃ પ્રત્યુવાય, 30 એકો જનો ચિરુશાલમ્પુરાદ્
 યિરીહોપુરં યાતિ, એતર્હિ દસ્યૂનાં કરેષુ પતિતે તે તસ્ય વસ્ત્રાદિકં હતવન્તઃ
 તમાહત્ય મૃતપ્રાચં કૃત્વા ત્યક્ત્વા યયુઃ | 31 અકસ્માદ્ એકો યાજકસ્તેન
 માર્ગેણ ગચ્છન્ તં દૃષ્ટ્વા માર્ગાન્ચપાશ્વેન જગામ | 32 ઇત્થમ્ એકો
 લેવીયસ્તસ્થાનં પ્રાપ્ય તસ્યાન્તિકં ગત્વા તં વિલોક્યાન્ચેન પાશ્વેન જગામ |
 33 કિન્ત્વેકઃ શોમિરોણીયો ગચ્છન્ તસ્થાનં પ્રાપ્ય તં દૃષ્ટ્વાદયત | 34
 તસ્યાન્તિકં ગત્વા તસ્ય ક્ષતેષુ તૈલં દ્રાક્ષારસન્ન પ્રક્ષિપ્ય ક્ષતાનિ બદ્ધ્વા
 નિજવાહનોપરિ તમુપવેશ્ય પ્રવાસીયગૃહમ્ આનીય તં સિષેવે | 35 પરસ્મિન્
 દિવસે નિજગમનકાલે દ્વૌ મુદ્રાપાદૌ તદ્દૃહસ્વામિને દત્વાવદત્ જનમેનં સેવસ્વ
 તત્ર યોડધિકો વ્યયો ભવિષ્યતિ તમહં પુનરાગમનકાલે પરિશોત્સ્યામિ | 36
 એષાં ત્રયાણાં મધ્યે તસ્ય દસ્યુહસ્તપતિતસ્ય જનસ્ય સમીપવાસી કઃ?
 ત્વયા કિં બુદ્ધ્યતે? 37 તતઃ સ વ્યવસ્થાપકઃ કથયામાસ યસ્તસ્મિન્ દયાં
 ચકાર | તદા યીશુઃ કથયામાસ ત્વમપિ ગત્વા તથાચર | 38 તતઃ પરં તે
 ગચ્છન્ત એકં ગ્રામં પ્રવિવિશુઃ; તદા મર્થાનામા સ્ત્રી સ્વગૃહે તસ્યાતિથ્યં

यकार | 39 तस्मात् मरियम् नामधेया तस्या भगिनी यीशोः पदसमीप
 उवविश्य तस्योपदेशकथां श्रोतुमारेभे | 40 किन्तु मर्था नानापेरियर्यायां
 व्यग्रा बलूव तस्माद्धेतोस्तस्य समीपमागत्य बलाघे; हे प्रभो मम भगिनी
 केवलं ममोपरि सर्वकर्मणां भारम् अर्पितवती तत्र भवता किञ्चिदपि न
 मनो निधीयते किम्? मम साहाय्यं कर्तुं भवान् तामादिशतु | 41 ततो यीशुः
 प्रत्युवाय हे मर्थे हे मर्थे, त्वं नानाकार्येषु यिन्तितवती व्यग्रा यासि, 42
 किन्तु प्रयोजनीयम् अेकमात्रम् आस्ते | अपरत्र यमुत्तमं भागं कोपि कर्तुं न
 शक्नोति सअेव मरियमा वृतः |

11 अनन्तरं स कस्मिंश्चित् स्थाने प्रार्थयत तत्समाप्तौ सत्यां तस्यैकः
 शिष्यस्तं जगाद हे प्रभो योऽहं यथा स्वशिष्यान् प्रार्थयितुम् उपदिष्टवान्
 तथा भवानप्यस्मान् उपदिशतु | 2 तस्मात् स कथयामास, प्रार्थनकाले
 यूयम् एत्थं कथयध्वं, हे अस्माकं स्वर्गस्थपितस्तव नाम पूज्यं भवतु; तव
 राजत्वं भवतु; स्वर्गं यथा तथा पृथिव्यामपि तवेच्छया सर्व्वं भवतु | 3
 प्रत्यहम् अस्माकं प्रयोजनीयं भोज्यं देहि | 4 यथा वयं सर्व्वान् अपराधिनः
 क्षमामहे तथा त्वमपि पापान्यस्माकं क्षमस्व | अस्मान् परीक्षां मानय
 किन्तु पापात्मनो रक्ष | 5 पश्चात् सोपरमपि कथितवान् यद्वि युष्माकं
 कस्यचिद् बन्धुस्तिष्ठति निशीथे य तस्य समीपं स गत्वा वदति, 6 हे
 बन्धो पथिक अेको बन्धु र्भम निवेशनम् आयातः किन्तु तस्यातिथ्यं कर्तुं
 भ्रमान्तिके किमपि नास्ति, अतअेव पूपत्रयं मह्यम् ऋणं देहि; 7 तदा स
 यद्वि गृहमध्यात् प्रतिवदति मां मा क्लिषान, एदानीं द्वारं रुद्धं शयने मया
 सड् बालकाश्च तिष्ठन्ति तुभ्यं दातुम् उत्थातुं न शक्नोमि, 8 तर्हि युष्मानडं
 वदामि, स यद्वि मित्रतया तस्मै किमपि दातुं नोत्तिष्ठति तथापि वारं वारं
 प्रार्थनात् उत्थापितः सन् यस्मिन् तस्य प्रयोजनं तदेव दास्यति | 9 अतः
 कारणात् कथयामि, यायध्वं ततो युष्मभ्यं दास्यते, मृगयध्वं तत उद्देशं
 प्राप्स्यथ, द्वारम् आडत ततो युष्मभ्यं द्वारं भोक्ष्यते | 10 यो यायते स
 प्राप्नोति, यो मृगयते स अेवोद्देशं प्राप्नोति, यो द्वारम् आडन्ति तदर्थं
 द्वारं भोक्ष्यते | 11 पुत्रेण पूपे यायिते तस्मै पाषाणं ददाति वा मत्स्ये
 यायिते तस्मै सर्पं ददाति 12 वा आर्डे यायिते तस्मै वृश्चिकं ददाति
 युष्माकं मध्ये क अेतादृशः पितास्ते? 13 तस्मादेव यूयमभद्रा अपि यद्वि

स्वस्वबालकेभ्य उतमानि द्रव्याणि दातुं ज्ञानीथ तर्ह्यस्माकं स्वर्गस्थः पिता
 निजयायकेभ्यः किं पवित्रम् आत्मानं न दास्यति? 14 अनन्तरं यीशुना
 कस्माच्चिद् अकस्मिन् मूकभूते त्याजिते सति स भूतत्यक्तो मानुषो वाक्यं
 वक्तुम् आरेभे; ततो लोकाः सकला आश्चर्य्यं मेनिरे | 15 किन्तु तेषां
 केचिद्भूयुर्जनीयं बालसिबूबा अर्थाद् भूतराजेन भूतान् त्याजयति | 16 तं
 परीक्षितुं केचिद् आकाशीयम् अकं चिह्नं दर्शयितुं तं प्रार्थयाञ्चकिरे | 17
 तदा स तेषां मनःकल्पनां ज्ञात्वा कथयामास, कस्यचिद् राज्यस्य लोका
 यद्दि परस्परं विरुन्धन्ति तर्हि तद् राज्यम् नश्यति; केचिद् गृहस्था यद्दि
 परस्परं विरुन्धन्ति तर्हि तेषि नश्यन्ति | 18 तथैव शैतानपि स्वलोकान्
 यद्दि विरुन्धन्ति तदा तस्य राज्यं कथं स्थास्यति? बालसिबूबाहं भूतान्
 त्याजयामि यूयमिति वदथ | 19 यदहं बालसिबूबा भूतान् त्याजयामि
 तर्हि युष्माकं सन्तानाः केन त्याजयन्ति? तस्मात् तत्रेव कथाया अेतस्या
 विचारयितारो भविष्यन्ति | 20 किन्तु यदहम् ईश्वरस्य पराक्रमेण भूतान्
 त्याजयामि तर्हि युष्माकं निकटम् ईश्वरस्य राज्यमवश्यम् उपतिष्ठति | 21
 बलवान् पुमान् सुसज्जमानो यतिकालं निजद्राविकां रक्षति ततिकालं तस्य
 द्रव्यं निरुपद्रवं तिष्ठति | 22 किन्तु तस्माद् अधिकबलः कश्चिदागत्य यद्दि
 तं जयति तर्हि येषु शस्त्रास्त्रेषु तस्य विश्वास आसीत् तानि सर्वाणि
 हत्वा तस्य द्रव्याणि गृह्णाति | 23 अतः कारणाद् यो मम सपक्षो न स
 विपक्षः, यो मया सह न संगृह्णाति स विकिरति | 24 अपरञ्च अमेध्यभूतो
 मानुषस्यान्तर्निर्गत्य शुष्कस्थाने भ्रान्त्वा विश्रामं भृगयते किन्तु न प्राप्य
 वदति मम यस्माद् गृह्णाद् आगतोहं पुनस्तद् गृहं परावृत्य यामि | 25 ततो
 गत्वा तद् गृहं मार्जितं शोभितञ्च दृष्ट्वा 26 तत्क्षणात् अपगत्य स्वस्मादपि
 दुर्भर्तान् अपरान् सप्तभूतान् सलानयति ते य तद्गृहं पविश्य निवसन्ति |
 तस्मात् तस्य मनुष्यस्य प्रथमदशातः शेषदशा दुःखतरा भवति | 27
 अस्याः कथायाः कथनकाले जनतामध्यस्था कायिन्नारी तमुच्यैःस्वरं प्रोवाय,
 या योषित् त्वां गवर्भेऽधारयत् स्तन्यमपाययस्य सैव धन्या | 28 किन्तु
 सोऽकथयत् ये परमेश्वरस्य कथां श्रुत्वा तदनुज्ञपम् आचरन्ति तत्रेव धन्याः |
 29 ततः परं तस्यान्तिके बहुलोकानां समागमे जाते स वक्तुमारोभे, आधुनिका
 दुष्टलोकान् चिह्नं द्रष्टुमिच्छन्ति किन्तु यूनस्त्वविष्यद्वादिनश्चिह्नं विनान्यत्

કિન્નિચ્ચિહ્નં તાન્ ન દર્શયિષ્યતે | 30 યૂનસ્ તુ યથા નીનિવીયલોકાનાં સમીપે
 ચિહ્નરૂપોભવત્ તથા વિદ્યમાનલોકાનામ્ એષાં સમીપે મનુષ્યપુત્રોપિ ચિહ્નરૂપો
 ભવિષ્યતિ | 31 વિચારસમયે ઇદાનીન્તનલોકાનાં પ્રાતિકૂલ્યેન દક્ષિણદેશીયા
 રાણી પ્રોત્યાય તાન્ દોષિણઃ કરિષ્યતિ, યતઃ સા રાણી સુલેમાન ઉપદેશકથાં
 શ્રોતું પૃથિવ્યાઃ સીમાત આગચ્છત્ કિન્તુ પશ્યત સુલેમાનોપિ ગુરુતર એકો
 જનોડસ્મિન્ સ્થાને વિદ્યતે | 32 અપરઞ્ચ વિચારસમયે નીનિવીયલોકા અપિ
 વર્તમાનકાલિકાનાં લોકાનાં વૈપરીત્યેન પ્રોત્યાય તાન્ દોષિણઃ કરિષ્યન્તિ,
 યતો હેતોસ્તે યૂનસો વાક્યાત્ ચિત્તાનિ પરિવર્તયામાસુઃ કિન્તુ પશ્યત
 યૂનસોતિગુરુતર એકો જનોડસ્મિન્ સ્થાને વિદ્યતે | 33 પ્રદીપં પ્રજ્વાલ્ય
 દ્રોણસ્વાધઃ કુત્રાપિ ગુપ્તસ્થાને વા કોપિ ન સ્થાપયતિ કિન્તુ ગૃહપ્રવેશિભ્યો
 દીપ્તિં દાતં દીપાધારોપય્યેવ સ્થાપયતિ | 34 દેહસ્ય પ્રદીપશ્ચક્ષુસ્તસ્માદેવ
 યક્ષુ ર્યદિ પ્રસન્નં ભવતિ તર્હિ તવ સર્વશરીરં દીપ્તિમદ્ ભવિષ્યતિ કિન્તુ યક્ષુ
 ર્યદિ મલીમસં તિષ્ઠતિ તર્હિ સર્વશરીરં સાન્ધકારં સ્થાસ્યતિ | 35 અસ્માત્
 કારણાત્ તવાન્તઃસ્થં જ્યોતિ ર્યથાન્ધકારમયં ન ભવતિ તદર્થે સાવધાનો
 ભવ | 36 યતઃ શરીરસ્ય કુત્રાપ્યંશે સાન્ધકારે ન જાતે સર્વ્યં યદિ દીપ્તિમત્
 તિષ્ઠતિ તર્હિ તુભ્યં દીપ્તિદાયિપ્રોજ્જ્વલન્ પ્રદીપ ઇવ તવ સર્વશરીરં
 દીપ્તિમદ્ ભવિષ્યતિ | 37 એતત્કથાયાઃ કથનકાલે ફિરુશ્યેકો ભેજનાય તં
 નિમન્ત્રયામાસ, તતઃ સ ગત્વા ભોક્તુમ્ ઉપવિવેશ | 38 કિન્તુ ભોજનાત્ પૂર્વ્યં
 નામાઙ્ક્ષીત્ એતદ્ દૃષ્ટ્વા સ ફિરુશ્યાશ્ચર્ય્યં મેને | 39 તદા પ્રભુસ્તં પ્રોવાય
 યૂયં ફિરુશિલોકાઃ પાનપાત્રાણાં ભોજનપાત્રાણાન્ન બહિઃ પરિષ્કુરુથ કિન્તુ
 યુષ્માકમન્ત દૌરાત્યૈ દૃષ્ટિયાભિશ્ચ પરિપૂર્ણાં તિષ્ઠતિ | 40 હે સર્વ્યે નિર્બોધા
 યો બહિઃ સસર્જ સ એવ કિમન્ત ન સસર્જ? 41 તત એવ યુષ્માભિરન્તઃકરણં
 (ઈશ્વરાય) નિવેદતાં તસ્મિન્ કૃતે યુષ્માકં સર્વ્યાણિ શુચિતાં યાસ્યન્તિ | 42
 કિન્તુ હન્ત ફિરુશિગણા યૂયં ન્યાયમ્ ઈશ્વરે પ્રેમ ય પરિત્યજ્ય પોદિનાયા
 અરુદાદીનાં સર્વ્યેષાં શાકાનાન્ન દશમાંશાન્ દત્થ કિન્તુ પ્રથમં પાલયિત્વા
 શેષસ્થાલક્ષ્ણં યુષ્માકમ્ ઉચિતમાસીત્ | 43 હા હા ફિરુશિનો યૂયં ભજનગેહે
 પ્રોચ્યાસને આપણેષુ ય નમસ્કારેષુ પ્રીયધ્વે | 44 વત કપટિનોડધ્યાપકાઃ
 ફિરુશિનશ્ચ લોકાયત્ શ્મશાનમ્ અનુપલભ્ય તદુપરિ ગચ્છન્તિ યૂયમ્
 તાદૃગપ્રકાશિતશ્મશાનવાદ્ ભવથ | 45 તદાનીં વ્યવસ્થાપકાનામ્ એકા

યીશુમવદત્, હે ઉપદેશક વાક્યેનેદૃશેનાસ્માસ્વપિ દોષમ્ આરોપયસિ | 46
 તતઃ સ ઉવાચ, હા હા વ્યવસ્થાપકા યૂયમ્ માનુષાણામ્ ઉપરિ દુઃસહ્યાન્
 ભારાન્ ન્યસ્યથ કિન્તુ સ્વયમ્ એકાઙ્ગુલ્યાપિ તાન્ ભારાન્ ન સ્પૃશથ | 47
 હન્ત યુષ્માકં પૂર્વપુરુષા યાન્ ભવિષ્યદ્વાદિનોડવધિષુસ્તેષાં શ્મશાનાનિ
 યૂયં નિર્માથ | 48 તેનૈવ યૂયં સ્વપૂર્વપુરુષાણાં કર્માણિ સંમન્યધ્વે તદેવ
 સપ્રમાણં કુરુથ ચ, યતસ્તે તાનવધિષુઃ યૂયં તેષાં શ્મશાનાનિ નિર્માથ |
 49 અતએવ ઈશ્વરસ્ય શાસ્ત્રે પ્રોક્તમસ્તિ તેષામન્તિકે ભવિષ્યદ્વાદિનઃ
 પ્રેરિતાંશ્ચ પ્રેષયિષ્યામિ તતસ્તે તેષાં કાંશ્ચન હનિષ્યન્તિ કાંશ્ચન તાડશ્ચિન્તિ |
 50 એતસ્માત્ કારણાત્ હાબિલઃ શોણિતપાતમારભ્ય મન્દિરચઙ્ગાવેધો
 ભધ્વે હતસ્ય સિખરિયસ્ય રક્તપાતપર્થ્યન્તં 51 જગતઃ સૃષ્ટિમારભ્ય
 પૃથિવ્યાં ભવિષ્યદ્વાદિનાં યતિરક્તપાતા જાતાસ્તતીનામ્ અપરાધદણ્ડા
 એષાં વર્તમાનલોકાનાં ભવિષ્યન્તિ, યુષ્માનહં નિશ્ચિતં વદામિ સર્વે દણ્ડા
 વંશસ્યાસ્ય ભવિષ્યન્તિ | 52 હા હા વ્યવસ્થાપકા યૂયં જ્ઞાનસ્ય કુઞ્ચિકાં હત્વા
 સ્વયં ન પ્રવેષ્ઠા યે પ્રવેષ્ઠા પ્રયાસિનસ્તાનપિ પ્રવેષ્ઠું વારિતવન્તઃ | 53 ઇત્યં
 કથાકથનાદ્ અધ્યાપકાઃ ફિરૂશિનશ્ચ સતર્કાઃ 54 સન્તસ્તમપવદિતું તસ્ય
 કથાયા દોષં ધર્તમિચ્છન્તો નાનાખ્યાનકથનાય તં પ્રવર્તયિતું કોપયિતુઞ્ચ
 પ્રારેભિરે |

12 તદાનીં લોકાઃ સહસ્રં સહસ્રમ્ આગત્ય સમુપસ્થિતાસ્તત એકૈકો
 ડન્યેષામુપરિ પતિતુમ્ ઉપચક્રમે; તદા યીશુઃ શિષ્યાન્ બભાષે, યૂયં ફિરૂશિનાં
 કિણ્વરૂપકાપટ્યે વિશેષેણ સાવધાનાસ્તિષ્ઠત | 2 યતો યન્ન પ્રકાશયિષ્યતે
 તદાચ્છન્નં વસ્તુ કિમપિ નાસ્તિ; તથા યન્ન જ્ઞાસ્યતે તદ્ ગુપ્તં વસ્તુ કિમપિ
 નાસ્તિ | 3 અન્ધકારે તિષ્ઠનતો યાઃ કથા અકથયત તાઃ સર્વાઃ કથા દીપ્તૌ
 શ્રોષ્યન્તે નિર્જને કર્ણો ચ યદકથયત ગૃહપૃષ્ઠાત્ તત્ પ્રચારયિષ્યતે | 4
 હે બન્ધવો યુષ્માનહં વદામિ, યે શરીરસ્ય નાશં વિના કિમપ્યપરં કર્તું ન
 શક્નુવન્તિ તેભ્યો મા ભૈષ્ઠ | 5 તર્હિ કસ્માદ્ ભેતવ્યમ્ ઇત્યહં વદામિ, યઃ
 શરીરં નાશયિત્વા નરકં નિક્ષેપ્તું શકનોતિ તસ્માદેવ ભયં કુરુત, પુનરપિ
 વદામિ તસ્માદેવ ભયં કુરુત | (Geenna g1067) 6 પઞ્ચ યટકપક્ષિણઃ કિં
 દ્વાભ્યાં તામ્રખણ્ડાભ્યાં ન વિક્રીયન્તે? તથાપીશ્વરસ્તેષામ્ એકમપિ ન
 વિસ્મરતિ | 7 યુષ્માકં શિરઃકેશા અપિ ગણિતાઃ સન્તિ તસ્માત્ મા વિભીત

બહુચટકપક્ષિભ્યોપિ યૂયં બહુમૂલ્યાઃ | 8 અપરં યુષ્મભ્યં કથયામિ યઃ
 કશ્ચિન્ માનુષાણાં સાક્ષાન્ માં સ્વીકરોતિ મનુષ્યપુત્ર ઈશ્વરદૂતાનાં સાક્ષાત્
 તં સ્વીકરિષ્યતિ | 9 કિન્તુ યઃ કશ્ચિન્માનુષાણાં સાક્ષાન્મામ્ અસ્વીકરોતિ
 તમ્ ઈશ્વરસ્ય દૂતાનાં સાક્ષાદ્ અહમ્ અસ્વીકરિષ્યામિ | 10 અન્યચ્ચ યઃ
 કશ્ચિન્ મનુજસુતસ્ય નિન્દાભાવેન કાઞ્ચિત્ કથાં કથયતિ તસ્ય તત્પાપસ્ય
 મોચનં ભવિષ્યતિ કિન્તુ યદિ કશ્ચિત્ પવિત્રમ્ આત્માનં નિન્દતિ તર્હિ
 તસ્ય તત્પાપસ્ય મોચનં ન ભવિષ્યતિ | 11 યદા લોકા યુષ્માન્ ભજનગેહં
 વિચારકર્તૃરાજ્યકર્તૃણાં સમ્મુખઞ્ચ નેષ્યન્તિ તદા કેન પ્રકારેણ કિમુત્તરં
 વદિષ્યથ કિં કથયિષ્યથ ચેત્યત્ર મા ચિન્તયતઃ; 12 યતો યુષ્માભિર્યદ્ યદ્
 વક્તવ્યં તત્ તસ્મિન્ સમયએવ પવિત્ર આત્મા યુષ્માન્ શિક્ષયિષ્યતિ | 13
 તતઃ પરં જનતામધ્યસ્થઃ કશ્ચિજજનસ્તં જગાદ હે ગુરો મયા સહ પૈતૃકં
 ધનં વિભક્તું મમ ભ્રાતરમાજ્ઞાપયતુ ભવાન્ | 14 કિન્તુ સ તમવદત્ હે
 મનુષ્ય યુવયો વિચારં વિભાગઞ્ચ કર્તુ માં કો નિયુક્તવાન્? 15 અનન્તરં સ
 લોકાનવદત્ લોભે સાવધાનાઃ સતર્કાશ્ચ તિષ્ઠત, યતો બહુસમ્પત્તિપ્રાપ્ત્યા
 મનુષ્યસ્યાયુર્ન ભવતિ | 16 પશ્ચાદ્ દૃષ્ટાન્તકથામુત્યાપ્ય કથયામાસ, એકસ્ય
 ધનિનો ભૂમૌ બહૂનિ શસ્યાનિ જાતાનિ | 17 તતઃ સ મનસા ચિન્તયિત્વા
 કથયામ્બભૂવ મમૈતાનિ સમુત્પન્નાનિ દ્રવ્યાણિ સ્થાપયિતું સ્થાનં નાસ્તિ
 કિં કરિષ્યામિ? 18 તતોવદદ્ ઇત્યં કરિષ્યામિ, મમ સર્વભાણ્ડાગારાણિ
 ભક્ત્વા બૃહદ્ભાણ્ડાગારાણિ નિર્માય તન્મધ્યે સર્વફલાનિ દ્રવ્યાણિ ય
 સ્થાપયિષ્યામિ | 19 અપરં નિજમનો વદિષ્યામિ, હે મનો બહુવત્સરાર્થ
 નાનાદ્રવ્યાણિ સઞ્ચિતાનિ સન્તિ વિશ્રામં કુરુ ભુક્ત્વા પીત્વા કૌતુકઞ્ચ કુરુ |
 કિન્ત્વીશ્વરસ્તમ્ અવદત્, 20 રે નિર્બોધ અધ રાત્રૌ તવ પ્રાણાસ્ત્વત્તો નેષ્યન્તે
 તત એતાનિ યાનિ દ્રવ્યાણિ ત્વયાસાદિતાનિ તાનિ કસ્ય ભવિષ્યન્તિ? 21
 અતએવ યઃ કશ્ચિદ્ ઈશ્વરસ્ય સમીપે ધનસઞ્ચયમકૃત્વા કેવલં સ્વનિકટે
 સઞ્ચયં કરોતિ સોપિ તાદૃશઃ | 22 અથ સ શિષ્યેભ્યઃ કથયામાસ, યુષ્માનહં
 વદામિ, કિં ખાદિષ્યામઃ? કિં પરિધાસ્યામઃ? ઇત્યુક્ત્વા જીવનસ્ય શરીરસ્ય
 ચાર્થં ચિન્તાં મા કાર્ષ | 23 ભક્ષ્યાજજીવનં ભૂષણાચ્છરીરઞ્ચ શ્રેષ્ઠં ભવતિ |
 24 કાકપક્ષિણાં કાર્થ્યં વિચારયત, તે ન વપન્તિ શસ્યાનિ ય ન છિન્દન્તિ, તેષાં
 ભાણ્ડાગારાણિ ન સન્તિ કોષાશ્ચ ન સન્તિ, તથાપીશ્વરસ્તેભ્યો ભક્ષ્યાણિ

દદાતિ, યૂયં પક્ષિભ્યઃ શ્રેષ્ઠતરા ન કિં? 25 અપરઞ્ચ ભાવયિત્વા નિજાયુષઃ
 ક્ષણમાત્રં વદ્ધયિતું શકનોતિ, એતાદૃશો લાકો યુષ્માકં મધ્યે કોસ્તિ? 26
 અતએવ ક્ષુદ્રં કાર્યં સાધયિતુમ્ અસમર્થા યૂયમ્ અન્યસ્મિન્ કાર્યં કુતો
 ભાવયથ? 27 અન્યચ્ચ કામ્પિલપુષ્પં કથં વદ્ધતે તદાપિ વિચારયત, તત્
 કઞ્ચન શ્રમં ન કરોતિ તન્તૂંશ્ચ ન જનયતિ કિન્તુ યુષ્મભ્યં યથાર્થં કથયામિ
 સુલેમાન્ બહૈશ્વર્યાન્વિતોપિ પુષ્પસ્યાસ્ય સદૃશો વિભૂષિતો નાસીત્ |
 28 અધ ક્ષેત્રે વર્તમાનં શ્વશ્રૂલ્લ્યાં ક્ષેપ્સ્યમાનં યત્ તૃણં, તસ્મૈ યદીશ્વર
 ઇત્યં ભૂષયતિ તર્હિ હે અલ્પપ્રત્યયિનો યુષ્માન કિં ન પરિધાપયિષ્યતિ?
 29 અતએવ કિં ખાદિષ્યામઃ? કિં પરિધાસ્યામઃ? એતદર્થં મા ચેષ્ટધ્વં મા
 સંદિગ્ધ્વઞ્ચ | 30 જગતો દેવાર્ચકા એતાનિ સર્વાણિ ચેષ્ટનતે; એષુ વસ્તુષુ
 યુષ્માકં પ્રયોજનમાસ્તે ઇતિ યુષ્માકં પિતા જાનાતિ | 31 અતએવેશ્વરસ્ય
 રાજ્યાર્થં સચેષ્ટા ભવત તથા કૃતે સર્વાણ્યેતાનિ દ્રવ્યાણિ યુષ્મભ્યં
 પ્રદાયિષ્યન્તે | 32 હે ક્ષુદ્રમેષવ્રજ યૂયં મા ભૈષ્ટ યુષ્મભ્યં રાજ્યં દાતું યુષ્માકં
 પિતુઃ સમ્મતિરસ્તિ | 33 અતએવ યુષ્માકં યા યા સમ્પત્તિરસ્તિ તાં તાં
 વિક્રીય વિતરત, યત્ સ્થાનં ચૌરા નાગચ્છન્તિ, કીટાશ્ચ ન ક્ષાયન્તિ તાદૃશે
 સ્વર્ગે નિજાર્થમ્ અજરે સમ્પુટકે ડક્ષયં ધનં સચ્ચિનુત ય; 34 યતો યત્ર યુષ્માકં
 ધનં વર્તતે તત્રેવ યુષ્માકં મનઃ | 35 અપરઞ્ચ યૂયં પ્રદીપં જ્વાલયિત્વા
 બદ્ધકટયસ્તિષ્ઠત; 36 પ્રભુ વિવાહાદાગત્ય યદૈવ દ્વારમાહન્તિ તદૈવ દ્વારં
 મોચયિતું યથા ભૃત્યા અપેક્ષ્ય તિષ્ઠન્તિ તથા યૂયમપિ તિષ્ઠત | 37 યતઃ
 પ્રભુરાગત્ય યાન્ દાસાન્ સચેતનાન્ તિષ્ઠતો દ્રક્ષ્યતિ તએવ ધન્યાઃ; અહં
 યુષ્માન્ યથાર્થં વદામિ પ્રભુસ્તાન્ ભોજનાર્થમ્ ઉપવેશ્ય સ્વયં બદ્ધકટિઃ
 સમીપમેત્ય પરિવેષયિષ્યતિ | 38 યદિ દ્વિતીયે તૃતીયે વા પ્રહરે સમાગત્ય
 તથૈવ પશ્યતિ, તર્હિ તએવ દાસા ધન્યાઃ | 39 અપરઞ્ચ કસ્મિન્ ક્ષણે
 ચૌરા આગમિષ્યન્તિ ઇતિ યદિ ગૃહપતિ જ્ઞાતું શકનોતિ તદાવશ્યં જાગ્રન્
 નિજગૃહે સન્ધિં કર્તાયિતું વારયતિ યૂયમેતદ્ વિત્ત | 40 અતએવ યૂયમપિ
 સજ્જમાનાસ્તિષ્ઠત યતો યસ્મિન્ ક્ષણે તં નાપ્રેક્ષધ્વે તસ્મિન્નેવ ક્ષણે
 મનુષ્યપુત્ર આગમિષ્યતિ | 41 તદા પિતરઃ પપ્રચ્છ, હે પ્રભો ભવાન્ કિમસ્માન્
 ઉદિશ્ય કિં સર્વાન્ ઉદિશ્ય દૃષ્ટાન્તકથામિમાં વદતિ? 42 તતઃ પ્રભુઃ
 પ્રોવાય, પ્રભુઃ સમુચિતકાલે નિજપરિવારાર્થં ભોજ્યપરિવેષણાય યં તત્પદે

નિયોક્ષ્યતિ તાદૃશો વિશ્વાસ્યો બોદ્ધા કર્મ્માધીશઃ કોસ્તિ? 43 પ્રભુરાગત્ય
 યમ્ એતાદૃશે કર્મ્મણિ પ્રવૃત્તં દ્રક્ષ્યતિ સએવ દાસો ધન્યઃ | 44 અહં
 યુષ્માન્ યથાર્થં વદામિ સ તં નિજસર્વ્વસ્વસ્યાધિપતિં કરિષ્યતિ | 45 કિન્તુ
 પ્રભુર્વિલમ્બેનાગમિષ્યતિ, ઇતિ વિચિન્ત્ય સ દાસો યદિ તદન્યદાસીદાસાન્
 પ્રહર્તુમ્ ભોક્તું પાતું મદિતુઞ્ચ પ્રારભતે, 46 તર્હિ યદા પ્રભું નાપેક્ષિષ્યતે
 યસ્મિન્ ક્ષણે સોડયેતનશ્ચ સ્થાસ્યતિ તસ્મિન્નેવ ક્ષણે તસ્ય પ્રભુરાગત્ય
 તં પદભ્રષ્ટં કૃત્વા વિશ્વાસહીનેઃ સહ તસ્ય અંશં નિરૂપયિષ્યતિ | 47 યો
 દાસઃ પ્રભેરાજાં જ્ઞાત્વાપિ સજ્જિજતો ન તિષ્ઠતિ તદાજ્ઞાનુસારેણ ચ કાર્યં ન
 કરોતિ સોનેકાન્ પ્રહારાન્ પ્રાપ્સ્યતિ; 48 કિન્તુ યો જનોડજ્ઞાત્વા પ્રહારાહં
 કર્મ કરોતિ સોલ્પપ્રહારાન્ પ્રાપ્સ્યતિ | યતો યસ્મૈ બાહુલ્યેન દત્તં તસ્માદેવ
 બાહુલ્યેન ગ્રહીષ્યતે, માનુષા યસ્ય નિકટે બહુ સમર્પયન્તિ તસ્માદ્ બહુ
 યાચન્તે | 49 અહં પૃથિવ્યામ્ અનૈક્યરૂપં વહ્નિ નિક્ષેપ્તુમ્ આગતોસ્મિ, સ
 ચેદ્ ઇદાનીમેવ પ્રજ્વલતિ તત્ર મમ કા ચિન્તા? 50 કિન્તુ યેન મજ્જનેનાહં
 મગ્નો ભવિષ્યામિ યાવત્કાલં તસ્ય સિદ્ધિર્ન ભવિષ્યતિ તાવદહં કતિકષ્ટં
 પ્રાપ્સ્યામિ | 51 મેલનં કર્તું જગદ્ આગતોસ્મિ યૂયં કિમિત્યં બોધધ્વે?
 યુષ્માન્ વદામિ ન તથા, કિન્ત્વહં મેલનાભાવં કર્તુમ્ આગતોસ્મિ | 52
 યસ્માદેતત્કાલમારભ્ય એકત્રસ્થપરિજનાનાં મધ્યે પઞ્ચજનાઃ પૃથગ્ ભૂત્વા
 ત્રયો જના દ્વયોર્જનયોઃ પ્રતિકૂલા દ્વૌ જનૌ ચ ત્રયાણાં જનાનાં પ્રતિકૂલૌ
 ભવિષ્યન્તિ | 53 પિતા પુત્રસ્ય વિપક્ષઃ પુત્રશ્ચ પિતુર્વિપક્ષો ભવિષ્યતિ માતા
 કન્યાયા વિપક્ષા કન્યા ચ માતુર્વિપક્ષા ભવિષ્યતિ, તથા શ્વશ્રૂર્બધ્વા વિપક્ષા
 બધૂશ્ચ શ્વશ્ર્વા વિપક્ષા ભવિષ્યતિ | 54 સ લોકેભ્યોપરમપિ કથયામાસ,
 પશ્ચિમદિશિ મેઘોદ્રમં દૃષ્ટ્વા યૂયં હઠાદ્ વદથ વૃષ્ટિર્ભવિષ્યતિ તતસ્તથૈવ
 જાયતે | 55 અપરં દક્ષિણતો વાયૌ વાતિ સતિ વદથ નિદાઘો ભવિષ્યતિ
 તતઃ સોપિ જાયતે | 56 રે રે કપટિન આકાશસ્ય ભૂમ્યાશ્ચ લક્ષણં બોદ્ધું
 શક્નુથ, 57 કિન્તુ કાલસ્યાસ્ય લક્ષણં કુતો બોદ્ધું ન શક્નુથ? યૂયઞ્ચ સ્વયં
 કુતો ન ન્યાષ્યં વિચારયથ? 58 અપરઞ્ચ વિવાદિના સાદ્ધ્વં વિચારયિતુઃ સમીપં
 ગચ્છન્ પથિ તસ્માદુદ્ધારં પ્રાપ્તું યતસ્વ નોચેત્ સ ત્વાં ધૃત્વા વિચારયિતુઃ
 સમીપં નયતિ | વિચારયિતા યદિ ત્વાં પ્રહર્તુઃ સમીપં સમર્પયતિ પ્રહર્તા

ત્વાં કારાયાં બધ્નાતિ 59 તર્હિ ત્વામહં વદામિ ત્વયા નિ:શેષં કપર્દકેષુ ન પરિશોધિતેષુ ત્વં તતો મુક્તિં પ્રાપ્તું ન શક્ષસિ |

13 અપરઞ્ચ પીલાતો યેષાં ગાલીલીયાનાં રક્તાનિ બલીનાં રક્તૈ: સહામિશ્રયત્ તેષાં ગાલીલીયાનાં વૃત્તાન્તં કતિપયજના ઉપસ્થાપ્ય યીશવે કથયામાસુ: | 2 તત: સ પ્રત્યુવાય તેષાં લોકાનામ્ એતાદૃશી દુર્ગતિ ઈટિતા તત્કારણાદ્ યૂયં કિમન્યેભ્યો ગાલીલીયેભ્યોપ્યધિકપાપિનસ્તાન્ બોધધ્વે? 3 યુષ્માનહં વદામિ તથા ન કિન્તુ મન:સુ ન પરાવર્તિતેષુ યૂયમપિ તથા નંક્ષયથ | 4 અપરઞ્ચ શીલોહનામ્ન ઉચ્યગૃહસ્ય પતનાદ્ યેડષ્ટાદશજના મૃતાસ્તે ચિરુશાલમિ નિવાસિસર્વલોકેભ્યોડધિકાપરાધિન: કિં યૂયમિત્યં બોધધ્વે? 5 યુષ્માનહં વદામિ તથા ન કિન્તુ મન:સુ ન પરિવર્તિતેષુ યૂયમપિ તથા નંક્ષયથ | 6 અનન્તરં સ ઇમાં દૃષ્ટાન્તકથામકથયદ્ એકો જનો દ્રાક્ષાક્ષેત્રમધ્ય એકમુદુમ્બરવૃક્ષં રોપિતવાન્ | પશ્ચાત્ સ આગત્ય તસ્મિન્ ફલાનિ ગવેષયામાસ, 7 કિન્તુ ફલાપ્રાપ્તે: કારણાદ્ ઉદ્યાનકારં ભૃત્યં જગાદ, પશ્ય વત્સરત્રયં યાવદાગત્ય એતસ્મિન્નુદુમ્બરતરૌ ક્ષલાન્યન્વિચ્છામિ, કિન્તુ નૈકમપિ પ્રપ્નોમિ તરુરયં કુતો વૃથા સ્થાનં વ્યાપ્ય તિષ્ઠતિ? એનં છિન્ધિ | 8 તતો ભૃત્ય: પ્રત્યુવાય, હે પ્રભો પુનર્વર્ષમેકં સ્થાતુમ્ આદિશ; એતસ્ય મૂલસ્ય ચતુર્દિક્ષુ ખનિત્વાહમ્ આલવાલં સ્થાપયામિ | 9 તત: ફલિતું શકનોતિ યદિ ન ફલતિ તર્હિ પશ્ચાત્ છેત્સ્યસિ | 10 અથ વિશ્રામવારે ભજનગેહે યીશુરુપદિશતિ 11 તસ્મિત્ સમયે ભૂતગ્રસ્તત્વાત્ કુબ્જભૂયાષ્ટાદશવર્ષાણિ યાવત્ કેનાપ્યુપાયેન ઋજુ ભવિતું ન શકનોતિ યા દુર્બલા સ્ત્રી, 12 તાં તત્રોપસ્થિતાં વિલોક્ય યીશુસ્તામાહૂય કથિતવાન્ હે નારિ તવ દૌર્બલ્યાત્ ત્વં મુક્તા ભવ | 13 તત: પરં તસ્યા ગાત્રે હસ્તાર્પણમાત્રાત્ સા ઋજુભૂત્વેશ્વરસ્ય ધન્યવાદં કર્તુમારેભે | 14 કિન્તુ વિશ્રામવારે યીશુના તસ્યા: સ્વાસ્થ્યકરણાદ્ ભજનગેહસ્યાધિપતિ: પ્રકુપ્ય લોકાન્ ઉવાય, ષટ્સુ દિનેષુ લોકૈ: કર્મ કર્તવ્યં તસ્માદ્દેતો: સ્વાસ્થ્યાર્થં તેષુ દિનેષુ આગચ્છત, વિશ્રામવારે માગચ્છત | 15 તદા પભુ: પ્રત્યુવાય રે કપટિનો યુષ્માકમ્ એકૈકો જનો વિશ્રામવારે સ્વીયં સ્વીયં વૃષભં ગર્દભં વા બન્ધનાન્મોચયિત્વા જલં પાયયિતું કિં ન નયતિ? 16 તદ્વાષ્ટાદશવત્સરાન્ યાવત્ શૈતાના બદ્ધા ઇબ્રાહીમ: સન્તતિરિયં નારી કિં વિશ્રામવારે ન મોચયિતવ્યા? 17 એષુ વાક્યેષુ કથિતેષુ તસ્ય

विपक्षाः सलज्जा जाताः किन्तु तेन कृतसर्वमहाकर्माकारणात् लोकनिवहः
 सानन्दोऽभवत् | 18 अनन्तरं सोवदद् ईश्वरस्य राज्यं कस्य सदृशं?
 केन तद्गुणमास्यामि? 19 यत् सर्षपबीजं गृहीत्वा कश्चिज्जन उधान
 उप्तवान् तद् बीजमङ्कुरितं सत् महावृक्षोऽजायत, ततस्तस्य शाखासु
 विहायसीयविडगा आगत्य न्युषुः, तद्राज्यं तादृशेन सर्षपबीजेन तुल्यं |
 20 पुनः कथयामास, ईश्वरस्य राज्यं कस्य सदृशं वदिष्यामि? यत् कि एवं
 काचित् स्त्री गृहीत्वा द्रोणत्रयपरिमितगोधूमयूर्णेषु स्थापयामास, 21 ततः
 कभोऽ तत् सर्वगोधूमयूर्णं व्याप्नोति, तस्य कि एवस्य तुल्यम् ईश्वरस्य
 राज्यं | 22 ततः स यिज्ञशालमगरं प्रति यात्रां कृत्वा नगरे नगरे ग्रामे ग्रामे
 समुपदिशन् जगाम | 23 तदा कश्चिज्जनस्तं पप्रच्छ, हे प्रभो किं केवलम्
 अल्पे लोकाः परित्रास्यन्ते? 24 ततः स लोकान् उवाच, संकीर्णद्वारेण
 प्रवेष्टुं यतध्वं, यतोऽं युष्मान् वदामि, बहवः प्रवेष्टुं चेष्टिष्यन्ते किन्तु न
 शक्यन्ति | 25 गृहपतिनोत्थाय द्वारे रुद्धे सति यदि यूयं बहिः स्थित्वा
 द्वारमाहृत्य वदथ, हे प्रभो हे प्रभो अस्मत्कारणाद् द्वारं भोययतु, ततः
 स एति प्रतिवक्ष्यति, यूयं कुत्रत्या लोका एत्यहं न जानामि | 26 तदा
 यूयं वदिष्यथ, तव साक्षाद् वयं भोजनं पानञ्च कृतवन्तः, त्वञ्चास्माकं
 नगरस्य पथि समुपदिष्टवान् | 27 किन्तु स वक्ष्यति, युष्मानहं वदामि, यूयं
 कुत्रत्या लोका एत्यहं न जानामि; हे दुराचारिणो यूयं मत्तो दूरीभवत | 28
 तदा एवमादीमं एरुहकं याकूबञ्च सर्व्वमविष्यद्वादिनश्च ईश्वरस्य राज्यं
 प्राप्तान् स्वाञ्च बहिष्कृतान् दृष्ट्वा यूयं रोदनं एन्तैर्नतघर्षणञ्च करिष्यथ |
 29 अपरञ्च पूर्व्वपश्चिमदक्षिणोत्तरदिग्भ्यो लोका आगत्य ईश्वरस्य राज्ये
 निवत्स्यन्ति | 30 पश्यतेत्यं शेषीया लोका अत्रा भविष्यन्ति, अत्रीया
 लोकाश्च शेषा भविष्यन्ति | 31 अपरञ्च तस्मिन् दिने कियन्तः द्विज्ञशिन
 आगत्य यीशुं प्रोयुः, बहिर्गच्छ, स्थानादस्मात् प्रस्थानं कुरु, हेरोद् त्वां
 जिघांसति | 32 ततः स प्रत्यवोयत् पश्यताध श्वश्च भूतान् विहाय
 रोगिणोऽरोगिणः कृत्वा तृतीयेहि सेत्स्यामि, कथामेतां यूयमित्वा तं
 भूरिमायं वदत | 33 तत्राप्यध श्वः परश्वश्च मया गमनागमने कर्त्तव्ये,
 यतो हेतो यिज्ञशालमो बहिः कुत्रापि कोपि भविष्यद्वादी न धानिष्यते | 34
 हे यिज्ञशालम् हे यिज्ञशालम् त्वं भविष्यद्वादिनो हंसि तवान्तिके प्रेरितान्

પ્રસ્તરૈર્મારયસિ ચ, યથા કુક્કુટી નિજપક્ષાઘઃ સ્વશાવકાન્ સંગૃહ્ણાતિ, તથાહમપિ તવ શિશૂન્ સંગ્રહીતું કતિવારાન્ ઐચ્છં કિન્તુ ત્વં નૈચ્છઃ | 35 પશ્યત યુષ્માકં વાસસ્થાનાનિ પ્રોચ્છિધમાનાનિ પરિત્યક્તાનિ ચ ભવિષ્યન્તિ; યુષ્માનહં યથાર્થં વદામિ, યઃ પ્રભો નર્મિનાગચ્છતિ સ ધન્ય ઇતિ વાચ્યં યાવત્કાલં ન વદિષ્યથ, તાવત્કાલં યૂયં માં ન દ્રક્ષ્યથ |

14 અનન્તરં વિશ્રામવારે યીશૌ પ્રધાનસ્ય દ્વિરૂશિનો ગૃહે ભોક્તું ગતવતિ તે તં વીક્ષિતુમ્ આરેભિરે | 2 તદા જલોદરી તસ્ય સમ્મુખે સ્થિતઃ | 3 તતઃ સ વ્યવસ્થાપકાન્ દ્વિરૂશિનશ્ચ પપ્રચ્છ, વિશ્રામવારે સ્વાસ્થ્યં કર્તવ્યં ન વા? તતસ્તે કિમપિ ન પ્રત્યૂયુઃ | 4 તદા સ તં રોગિણં સ્વસ્થં કૃત્વા વિસસર્જ; 5 તાનુવાચ ચ યુષ્માકં કસ્યચિદ્ ગર્દભો વૃષભો વા ચેદ્ ગર્તે પતતિ તર્હિ વિશ્રામવારે તત્ક્ષણં સ કિં તં નોત્થાપયિષ્યતિ? 6 તતસ્તે કથાયા એતસ્યાઃ કિમપિ પ્રતિવક્તું ન શેકુઃ | 7 અપરઞ્ચ પ્રધાનસ્થાનમનોનીતત્વકરણં વિલોક્ય સ નિમન્ત્રિતાન્ એતદ્દુપદેશકથાં જગાદ, 8 ત્વં વિવાહાદિભોજ્યેષુ નિમન્ત્રિતઃ સન્ પ્રધાનસ્થાને મોપાવેક્ષીઃ | ત્વત્તો ગૌરવાન્વિતનિમન્ત્રિતજન આયાતે 9 નિમન્ત્રયિતાગત્ય મનુષ્યાચૈતસ્મૈ સ્થાનં દેહીતિ વાક્યં ચેદ્ વક્ષ્યતિ તર્હિ ત્વં સકુચિતો ભૂત્વા સ્થાન ઇતરસ્મિન્ ઉપવેષ્ટુમ્ ઉદ્યંસ્યસિ | 10 અસ્માત્ કારણાદેવ ત્વં નિમન્ત્રિતો ગત્વાડપ્રધાનસ્થાન ઉપવિશ, તતો નિમન્ત્રયિતાગત્ય વદિષ્યતિ, હે બન્ધો પ્રોચ્યસ્થાનં ગત્વોપવિશ, તથા સતિ ભોજનોપવિષ્ટાનાં સકલાનાં સાક્ષાત્ ત્વં માન્યો ભવિષ્યસિ | 11 યઃ કશ્ચિત્ સ્વમુન્નમયતિ સ નમયિષ્યતે, કિન્તુ યઃ કશ્ચિત્ સ્વં નમયતિ સ ઉન્નમયિષ્યતે | 12 તદા સ નિમન્ત્રયિતારં જનમપિ જગાદ, મધ્યાહ્ને રાત્રૌ વા ભોજ્યે કૃતે નિજબન્ધુગણો વા ભ્રાતૃગણો વા જ્ઞાતિગણો વા ધનિગણો વા સમીપવાસિગણો વા એતાન્ ન નિમન્ત્રય, તથા કૃતે ચેત્ તે ત્વાં નિમન્ત્રયિષ્યન્તિ, તર્હિ પરિશોધો ભવિષ્યતિ | 13 કિન્તુ યદા ભેજ્યં કરોષિ તદા દરિદ્રશુષ્કકરખન્જાન્ધાન્ નિમન્ત્રય, 14 તત આશિષં લપ્સ્યસે, તેષુ પરિશોધં કર્તુમશક્નુવત્સુ શ્મશાનાદ્ભિર્મિકાનામુત્થાનકાલે ત્વં ફલાં લપ્સ્યસે | 15 અનન્તરં તાં કથાં નિશમ્ય ભોજનોપવિષ્ટઃ કશ્ચિત્ કથયામાસ, યો જન ઈશ્વરસ્ય રાજ્યે ભોક્તું લપ્સ્યતે સએવ ધન્યઃ | 16 તતઃ સ ઉવાચ, કશ્ચિત્ જનો રાત્રૌ ભેજ્યં કૃત્વા બહૂન્ નિમન્ત્રયામાસ |

17 ततो लोचनसमये निमन्त्रितलोकान् आह्वातुं दासद्वारा कथयामास,
 भधद्रव्याणि सर्वाणि समासादितानि सन्ति, यूयमागच्छत। 18 किन्तु
 ते सर्व्व ऐकैकं छलं कृत्वा क्षमां प्रार्थयाञ्चक्रिरे। प्रथमो जनः कथयामास,
 क्षेत्रमेकं क्रीतवानलं तदेव द्रष्टुं मया गन्तव्यम्, अतएव मां क्षन्तुं तं निवेद्य।
 19 अन्यो जनः कथयामास, दशवृषानलं क्रीतवान् तान् परीक्षितुं यामि
 तस्मादेव मां क्षन्तुं तं निवेद्य। 20 अपरः कथयामास, व्यूढवानलं तस्मात्
 कारणाद् यातुं न शक्नोमि। 21 पश्चात् स दासो गत्वा निजप्रभोः साक्षात्
 सर्व्ववृत्तान्तं निवेदयामास, ततोसौ गृहपतिः कुपित्वा स्वदासं व्याजहार,
 त्वं सत्वरं नगरस्य सन्निवेशान् मार्गाश्च गत्वा दरिद्रशुष्करभ्रजान्धान्
 अत्रानय। 22 ततो दासोऽवदत्, हे प्रभो भवत आज्ञानुसारेणाकियत
 तथापि स्थानमस्ति। 23 तदा प्रभुः पुनर् दासायाकथयत्, राजपथान्
 वृक्षमूलानि य यात्वा मदीयगृहपूरणार्थं लोकानागन्तुं प्रवर्त्तय। 24 अलं
 युष्मभ्यं कथयामि, पूर्व्वनिमन्त्रितानमेकोपि ममास्य रात्रिभोज्यस्यास्वादं
 न प्राप्स्यति। 25 अनन्तरं बहुषु लोकेषु यीशोः पश्चाद् प्रजितेषु सत्सु
 स व्याघृत्य तेभ्यः कथयामास, 26 यः कश्चिन् मम समीपम् आगत्य
 स्वस्य माता पिता पत्नी सन्ताना ब्रातरो भगिन्यो निजप्राणाश्च, अतेभ्यः
 सर्व्वेभ्यो मय्यधिकं प्रेम न करोति, स मम शिष्यो भवितुं न शक्यति।
 27 यः कश्चित् स्वीयं कुशं वलन् मम पश्चान्न गच्छति, सोपि मम शिष्यो
 भवितुं न शक्यति। 28 दुर्गनिर्माणे कतिव्ययो भविष्यति, तथा तस्य
 समाप्तिकरणार्थं सम्पत्तिरस्ति न वा, प्रथममुपविश्य अतन्नं गणयति,
 युष्माकं मध्य अतादृशः कोस्ति? 29 नोयेद् भित्तिं कृत्वा शेषे यदि समापयितुं
 न शक्यति, 30 तर्हि भानुषोयं नियेतुम् आरभत समापयितुं नाशक्नोत्,
 इति व्याहृत्य सर्व्वे तमुपलसिष्यन्ति। 31 अपरञ्च भिन्नभूपतिना सल
 युद्धं कर्त्तुम् उधम्य दशसलस्राणि सैन्यानि गृहीत्वा विंशतिसलस्रेः सैन्यैः
 सलितस्य समीपवासिनः सम्मुष्णं यातुं शक्यामि न वेति प्रथमं उपविश्य न
 विचारयति अतादृशो भूमिपतिः कः? 32 यदि न शक्नोति तर्हि रिपावतिदूरे
 तिष्ठति सति निजदूतं प्रेष्य सन्धिं कर्त्तुं प्रार्थयेत्। 33 तद्वद् युष्माकं मध्ये
 यः कश्चिन् मदर्थं सर्व्वस्वं लान्तुं न शक्नोति स मम शिष्यो भवितुं न
 शक्यति। 34 लवणम् उत्तमम् इति सत्यं, किन्तु यदि लवणस्य लवणत्वम्

अपगच्छति तर्हि तत् कथं स्वाद्भ्युक्तं भविष्यति? 35 तदा तद्भूम्यर्थम्
आलवालराशयर्थमपि तद्भ्रं न भवति; लोकास्तद् बहिः क्षिपन्ति। यस्य
श्रोतुं श्रोत्रे स्तः स शृणोतु।

15 तदा कस्मात्पापिनः पापिनश्च लोका उपदेशकथां श्रोतुं यीशोः समीपम्
आगच्छन्। 2 ततः द्विंशतिनोऽपि विवदमानाः कथयामासुः अपि
मानुषः पापिभिः सह प्राण्यं कृत्वा तैः सार्द्धं भुङ्क्ते। 3 तदा स तेभ्य
एषां दृष्टान्तकथां कथितवान्, 4 कस्यचित् शतमेषेषु तिष्ठन्तु तेषामेकं स
यदि हारयति तर्हि मध्येप्रान्तरम् अकोनशतमेषान् विहाय हारितमेषस्य
उद्देशप्राप्तिपर्यन्तं न गवेषयति, अतोदृशो लोको युष्माकं मध्ये क
आस्ते? 5 तस्योद्देशं प्राप्य हृष्टमनास्तं स्कन्धे निधाय स्वस्थानम् आनीय
बन्धुबान्धवसमीपवासिन आहूय वक्ति, 6 हारितं मेषं प्राप्तोऽहम् अतो हेतो
र्मया सार्द्धम् आनन्दत। 7 तद्दृष्टं युष्मान् वदामि, येषां मनःपरावर्तनस्य
प्रयोजनं नास्ति, तादृशैकोनशतधार्मिककारणाद् य आनन्दस्तस्माद् अकस्य
मनःपरिवर्तनः पापिनः कारणात् स्वर्गे ऽधिकानन्दो जायते। 8 अपरञ्च
दृष्टान्तं इत्यभारुडानाम् अकभारुडे हारिते प्रदीपं प्रज्वाल्य गृहं सम्मार्ज्यं
तस्य प्राप्तिं यावद् यत्नेन न गवेषयति, अतोदृशी योषित् कारते? 9 प्राप्ते
सति बन्धुबान्धवसमीपवासिनीराहूय कथयति, हारितं इत्यभारुडं प्राप्ताहं
तस्मादेव मया सार्द्धम् आनन्दत। 10 तद्दृष्टं युष्मान् व्याहरामि, अकेन
पापिना मनसि परिवर्तिते, ईश्वरस्य दूतानां मध्येप्यानन्दो जायते। 11
अपरञ्च स कथयामास, कस्यचिद् द्वौ पुत्रावास्तां, 12 तयोः कनिष्ठः पुत्रः पित्रे
कथयामास, हे पितस्तव सम्पत्त्या यमंशं प्राप्स्याम्यहं विभज्य तं देहि,
ततः पिता निजं सम्पत्तिं विभज्य ताभ्यां ददौ। 13 कतिपयात् कालात् परं
स कनिष्ठपुत्रः समस्तं धनं संगृह्य दूरदेशं गत्वा दृष्टायरणेन सर्व्वां सम्पत्तिं
नाशयामास। 14 तस्य सर्व्वधने व्ययं गते तद्देशे मलाद्दुर्भिक्षं बभूव,
ततस्तस्य दैन्यदशा भवितुम् आरेभे। 15 ततः परं स गत्वा तद्देशीयं
गृहस्थमेकम् आश्रयत; ततः सतं शूकरप्रजं यारयितुं प्रान्तरं प्रेषयामास।
16 केनापि तस्मै भक्ष्यादानात् स शूकरकुलवल्कलेन पित्रिण्डपूरणां ववाञ्छ।
17 शेषे स मनसि येतनां प्राप्य कथयामास, हा मम पितुः समीपे कति कति
वेतनभुजो दासा यथेष्टं ततोधिकञ्च भक्ष्यं प्राप्नुवन्ति किन्त्वहं क्षुधा भुमूर्षुः।

18 અહમુત્થાય પિતુઃ સમીપં ગત્વા કથામેતાં વદિષ્યામિ, હે પિતર્ ઈશ્વરસ્ય તવ ચ વિરુદ્ધં પાપમકરવમ્ 19 તવ પુત્રઘતિ વિખ્યાતો ભવિતું ન યોગ્યોસ્મિ ચ, માં તવ વૈતનિકં દાસં કૃત્વા સ્થાપય | 20 પશ્ચાત્ સ ઉત્થાય પિતુઃ સમીપં જગામ; તતસ્તસ્ય પિતાતિદૂરે તં નિરીક્ષ્ય દયાઞ્ચક્રે, ધાવિત્વા તસ્ય કણ્ઠં ગૃહીત્વા તં ચુચુમ્બ ચ | 21 તદા પુત્ર ઉવાચ, હે પિતર્ ઈશ્વરસ્ય તવ ચ વિરુદ્ધં પાપમકરવં, તવ પુત્રઘતિ વિખ્યાતો ભવિતું ન યોગ્યોસ્મિ ચ | 22 કિન્તુ તસ્ય પિતા નિજદાસાન્ આદિદેશ, સર્વોત્તમવસ્ત્રાણ્યાનીય પરિધાપયતૈનં હસ્તે ચાકુરીયકમ્ અર્પયત પાદયોશ્ચોપાનહૌ સમર્પયત; 23 પુષ્ટં ગોવત્સમ્ આનીય મારયત ચ તં ભુક્ત્વા વયમ્ આનન્દામ | 24 યતો મમ પુત્રોયમ્ અમ્રિયત પુનરજીવીદ્ હારિતશ્ચ લબ્ધોભૂત્ તતસ્ત આનન્દિતુમ્ આરેભિરે | 25 તત્કાલે તસ્ય જ્યેષ્ઠઃ પુત્રઃ ક્ષેત્ર આસીત્ | અથ સ નિવેશનસ્ય નિકટં આગચ્છન્ નૃત્યાનાં વાધાનાઞ્ચ શબ્દં શ્રુત્વા 26 દાસાનામ્ એકમ્ આહૂય પપ્રચ્છ, કિં કારણમસ્ય? 27 તતઃ સોવાદીત્, તવ ભ્રાતાગમત્, તવ તાતશ્ચ તં સુશરીરં પ્રાપ્ય પુષ્ટં ગોવત્સં મારિતવાન્ | 28 તતઃ સ પ્રકુપ્ય નિવેશનાન્તઃ પ્રવેષ્ટું ન સમ્ભેને; તતસ્તસ્ય પિતા બહિરાગત્ય તં સાધયામાસ | 29 તતઃ સ પિતરં પ્રત્યુવાચ, પશ્ય તવ કાઞ્ચિદપ્યાજ્ઞાં ન વિલંઘ્ય બહૂન્ વત્સરાન્ અહં ત્વાં સેવે તથાપિ મિત્રૈઃ સાર્દ્ધમ્ ઉત્સવં કર્તુમ્ કદાપિ છાગમેકમપિ મહ્યં નાદદાઃ; 30 કિન્તુ તવ ચઃ પુત્રો વેશ્યાગમનાદિભિસ્તવ સમ્પત્તિમ્ અપવ્યયિતવાન્ તસ્મિન્નાગતમાત્રે તસ્યૈવ નિમિત્તં પુષ્ટં ગોવત્સં મારિતવાન્ | 31 તદા તસ્ય પિતાવોચત્, હે પુત્ર ત્વં સર્વ્વદા મયા સહાસિ તસ્માન્ મમ યદદાસ્તે તત્સર્વ્વં તવ | 32 કિન્તુ તવાયં ભ્રાતા મૃતઃ પુનરજીવીદ્ હારિતશ્ચ ભૂત્વા પ્રાપ્તોભૂત્, એતસ્માત્ કારણાદ્ ઉત્સવાનન્દૌ કર્તુમ્ ઉચિતમસ્માકમ્ |

16 અપરઞ્ચ યીશુઃ શિષ્યેભ્યોન્યામેકાં કથાં કથયામાસ કસ્યચિદ્ ધનવતો મનુષ્યસ્ય ગૃહકાર્ય્યાધીશે સમ્પત્તેરપવ્યયેડપવાદિતે સતિ 2 તસ્ય પ્રભુસ્તમ્ આહૂય જગાદ, ત્વયિ યામિમાં કથાં શૃણોમિ સા કીદૃશી? ત્વં ગૃહકાર્ય્યાધીશકર્મ્મણો ગણનાં દર્શય ગૃહકાર્ય્યાધીશપદે ત્વં ન સ્થાસ્યસિ | 3 તદા સ ગૃહકાર્ય્યાધીશો મનસા ચિન્તયામાસ, પ્રભુ ર્ચદિ માં ગૃહકાર્ય્યાધીશપદાદ્ ભંશયતિ તર્હિ કિં કરિષ્યેડહં? મૃદું ખનિતું મમ શક્તિ નાસ્તિ ભિક્ષિતુઞ્ચ લજ્જિષ્યેડહં | 4 અતએવ મયિ

ગૃહકાર્ય્યાધીશપદાત્ ચ્યુતે સતિ યથા લોકા મહ્યમ્ આશ્રયં દાસ્યન્તિ
 તદર્થં ચત્કર્મ્મ મયા કરણીયં તન્ નિર્ણયિતે | 5 પશ્ચાત્ સ સ્વપ્રભોરેકૈકમ્
 અધમર્ણમ્ આહૂય પ્રથમં પપ્રચ્છ, ત્વત્તો મે પ્રભુણા કતિ પ્રાપ્યમ્? 6
 તતઃ સ ઉવાચ, એકશતાઢકતૈલાનિ; તદા ગૃહકાર્ય્યાધીશઃ પ્રોવાચ, તવ
 પત્રમાનીય શીઘ્રમુપવિશ્ય તત્ર પત્રાશતં લિખ | 7 પશ્ચાદન્યમેકં પપ્રચ્છ,
 ત્વત્તો મે પ્રભુણા કતિ પ્રાપ્યમ્? તતઃ સોવાદીદ્ એકશતાઢકગોધૂમાઃ; તદા સ
 કથયામાસ, તવ પત્રમાનીય અશીર્તિ લિખ | 8 તેનૈવ પ્રભુસ્તમયથાર્થકૃતમ્
 અધીશં તદ્ભુદ્ધિનૈપુણ્યાત્ પ્રશશંસ; ઇત્યં દીપ્તિરૂપસન્તાનેભ્ય એતત્સંસારસ્ય
 સન્તાના વર્તમાનકાલેડધિકબુદ્ધિમન્તો ભવન્તિ | (aiōn g165) 9 અતો વદામિ
 યૂયમયથાર્થેન ધનેન મિત્રાણિ લભધ્વં તતો યુષ્માસુ પદભ્રષ્ટેષ્વપિ તાનિ
 ચિરકાલમ્ આશ્રયં દાસ્યન્તિ | (aiōnios g166) 10 યઃ કશ્ચિત્ ક્ષુદ્રે કાર્ય્યો
 વિશ્વાસ્યો ભવતિ સ મહતિ કાર્ય્યેપિ વિશ્વાસ્યો ભવતિ, કિન્તુ યઃ કશ્ચિત્
 ક્ષુદ્રે કાર્ય્યેડવિશ્વાસ્યો ભવતિ સ મહતિ કાર્ય્યેપ્યવિશ્વાસ્યો ભવતિ | 11
 અતએવ અયથાર્થેન ધનેન યદિ યૂયમવિશ્વાસ્યા જાતાસ્તર્હિ સત્યં ધનં
 યુષ્માકં કરેષુ કઃ સમર્પયિષ્યતિ? 12 યદિ ય પરધનેન યૂયમ્ અવિશ્વાસ્યા
 ભવથ તર્હિ યુષ્માકં સ્વકીયધનં યુષ્મભ્યં કો દાસ્યતિ? 13 કોપિ દાસ ઉભૌ
 પ્રભૂ સેવિતું ન શક્નોતિ, યત એકસ્મિન્ પ્રીયમાણોડન્યસ્મિન્નપ્રીયતે યદ્વા
 એકં જનં સમાદૃત્ય તદન્યં તુચ્છીકરોતિ તદ્દદ્ યૂયમપિ ધનેશ્વરૌ સેવિતું ન
 શક્નુથ | 14 તદૈતાઃ સર્વ્યાઃ કથાઃ શ્રુત્વા લોભિક્કિરૂશિનસ્તમુપજહસુઃ | 15
 તતઃ સ ઉવાચ, યૂયં મનુષ્યાણાં નિકટે સ્વાન્ નિર્દોષાન્ દર્શયથ કિન્તુ યુષ્માકમ્
 અન્તઃકરણાનીશ્વરો જાનાતિ, યત્ મનુષ્યાણામ્ અતિ પ્રશંસ્યં તદ્ ઈશ્વરસ્ય
 ઘૃણ્યં | 16 યોહન આગમનપર્યનતં યુષ્માકં સમીપે વ્યવસ્થાભવિષ્યદ્વાદિનાં
 લેખનાનિ યાસન્ તતઃ પ્રભૃતિ ઈશ્વરરાજ્યસ્ય સુસંવાદઃ પ્રચરતિ, એકેકો
 લોકસ્તન્મધ્યં યત્નેન પ્રવિશતિ ચ | 17 વરં નભસઃ પૃથિવ્યાશ્ચ લોપો
 ભવિષ્યતિ તથાપિ વ્યવસ્થાયા એકભિન્દોરપિ લોપો ન ભવિષ્યતિ | 18
 યઃ કશ્ચિત્ સ્વીયાં ભાર્ય્યાં વિહાય સ્ત્રિયમન્યાં વિવહતિ સ પરદારાન્
 ગચ્છતિ, યશ્ચ તા ત્યક્તાં નારીં વિવહતિ સોપિ પરદારાન ગચ્છતિ | 19
 એકો ધની મનુષ્યઃ શુકલાનિ સૂક્ષ્માણિ વસ્ત્રાણિ પર્યદઘાત્ પ્રતિદિનં
 પરિતોષરૂપેણાભુંકતાપિવચ્ય | 20 સર્વ્યાંકે ક્ષતયુક્ત ઇલિયાસરનામા

કશ્ચિદ્ દરિદ્રસ્તસ્ય ધનવતો ભોજનપાત્રાત્ પતિતમ્ ઉચ્છિષ્ટં ભોક્તું વાઞ્છન્
તસ્ય દ્વારે પતિત્વાતિષ્ઠત્; 21 અથ શ્વાન આગત્ય તસ્ય ક્ષતાન્યલિહન્ |
22 કિયત્કાલાત્પરં સ દરિદ્રઃ પ્રાણાન્ જહૌ; તતઃ સ્વર્ગીયદૂતાસ્તં નીત્વા
ઇબ્રાહીમઃ ક્રોડ ઉપવેશયામાસુઃ | 23 પશ્ચાત્ સ ધનવાનપિ મમાર, તં
શ્મશાને સ્થાપયામાસુશ્ચ; કિન્તુ પરલોકે સ વેદનાકુલઃ સન્ ઉર્દ્ધ્વાં નિરીક્ષ્ય
બહુદૂરાદ્ ઇબ્રાહીમં તત્ક્રોડ ઇલિયાસરઞ્ચ વિલોક્ય રુવન્નુવાચ; (Hadēs
986) 24 હે પિતર્ ઇબ્રાહીમ્ અનુગૃહ્ય અઙ્ગુલ્યગ્રભાગં જલે મજ્જયિત્વા મમ
જિહ્વાં શીતલાં કર્તુમ્ ઇલિયાસરં પ્રેરય, યતો વહ્નિશિખાતોહં વ્યથિતોસ્મિ |
25 તદા ઇબ્રાહીમ્ બભાષે, હે પુત્ર ત્વં જીવન્ સમ્પદં પ્રાપ્તવાન્ ઇલિયાસરસ્તુ
વિપદં પ્રાપ્તવાન્ એતત્ સ્મર, કિન્તુ સમ્પ્રતિ તસ્ય સુખં તવ ચ દુઃખં ભવતિ |
26 અપરમપિ યુષ્માકમ્ અસ્માકઞ્ચ સ્થાનયોર્મધ્યે મહદ્વિચ્છેદોડસ્તિ તત
એતસ્થાનસ્ય લોકાસ્તત્ સ્થાનં યાતું યદ્વા તસ્થાનસ્ય લોકા એતત્
સ્થાનમાયાતું ન શક્નુવન્તિ | 27 તદા સ ઉક્તવાન્, હે પિતસ્તર્હિ ત્વાં
નિવેદયામિ મમ પિતુર્ ગૌહે યે મમ પત્નિ ભ્રાતરઃ સન્તિ 28 તે યથૈતદ્
યાતનાસ્થાનં નાયાસ્યન્તિ તથા મન્ત્રણાં દાતું તેષાં સમીપમ્ ઇલિયાસરં
પ્રેરય | 29 તત ઇબ્રાહીમ્ ઉવાચ, મૂસાભવિષ્યદ્વાદિનાઞ્ચ પુસ્તકાનિ તેષાં
નિકટે સન્તિ તે તદ્વચનાનિ મન્યન્તાં | 30 તદા સ નિવેદયામાસ, હે પિતર્
ઇબ્રાહીમ્ ન તથા, કિન્તુ યદિ મૃતલોકાનાં કશ્ચિત્ તેષાં સમીપં યાતિ
તર્હિ તે મનાંસિ વ્યાઘોટયિષ્યન્તિ | 31 તત ઇબ્રાહીમ્ જગાદ, તે યદિ
મૂસાભવિષ્યદ્વાદિનાઞ્ચ વચનાનિ ન મન્યન્તે તર્હિ મૃતલોકાનાં કસ્મિંશ્ચિદ્
ઉત્થિતેપિ તે તસ્ય મન્ત્રણાં ન મંસ્યન્તે |

17 ઇતઃ પરં ચીશુઃ શિષ્યાન્ ઉવાચ, વિઘ્નૈરવશ્યમ્ આગન્તવ્યં કિન્તુ
વિઘ્ના યેન ઘટિષ્યન્તે તસ્ય દુર્ગતિર્ભવિષ્યતિ | 2 એતેષાં ક્ષુદ્રપ્રાણિનામ્
એકસ્યાપિ વિઘ્નજનનાત્ કાણ્ઠબદ્ધપેષણીકસ્ય તસ્ય સાગરાગાઘજલે
મજ્જનં ભદ્રં | 3 યૂયં સ્વેષુ સાવધાનાસ્તિષ્ઠતઃ તવ ભ્રાતા યદિ તવ કિંચ્ચિદ્
અપરાધ્યતિ તર્હિ તં તર્જય, તેન યદિ મનઃ પરિવર્તયતિ તર્હિ તં ક્ષમસ્વ | 4
પુનરેકદિનમધ્યે યદિ સ તવ સપ્તકૃત્વોડપરાધ્યતિ કિન્તુ સપ્તકૃત્વ આગત્ય
મનઃ પરિવર્ત્ય મયાપરાદ્ધમ્ ઇતિ વદતિ તર્હિ તં ક્ષમસ્વ | 5 તદા પ્રેરિતાઃ
પ્રભુમ્ અવદન્ અસ્માકં વિશ્વાસં વર્દ્ધય | 6 પ્રભુરુવાચ, યદિ યુષ્માકં

સર્ષપૈકપ્રમાણો વિશ્વાસોસ્તિ તર્હિ ત્વં સમૂલમુત્પાટિતો ભૂત્વા સમુદ્રે રોપિતો
 ભવ કથાયામ્ એતસ્યામ્ એતદ્દુહ્મ્બરાય કથિતાયાં સ યુષ્માકમાજ્ઞાવહો
 ભવિષ્યતિ | 7 અપરં સ્વદાસે હલં વાહયિત્વા વા પશૂન્ ચારયિત્વા ક્ષેત્રાદ્
 આગતે સતિ તં વદતિ, એહિ ભોક્તુમુપવિશ, યુષ્માકમ્ એતાદૃશઃ કોસ્તિ?
 8 વરઞ્ચ પૂર્વ્વં મમ ખાધમાસાધ યાવદ્ ભુજ્ને પિવામિ ચ તાવદ્ બદ્ધકટિઃ
 પરિચર પશ્ચાત્ ત્વમપિ ભોક્ષ્યસે પાસ્યસિ ચ કથામીદૃશીં કિં ન વક્ષ્યતિ? 9
 તેન દાસેન પ્રભોરાજ્ઞાનુરૂપે કર્મ્મણિ કૃતે પ્રભુઃ કિં તસ્મિન્ બાધિતો જાતઃ?
 નેત્યં બુધ્યતે મયા | 10 ઇત્યં નિરૂપિતેષુ સર્વ્વકર્મ્મસુ કૃતેષુ સત્મુ યૂયમપીદં
 વાક્યં વદથ, વયમ્ અનુપકારિણો દાસા અસ્માભિર્યધત્કર્ત્તવ્યં તન્માત્રમેવ
 કૃતં | 11 સ યિરૂશાલમિ યાત્રાં કુર્વ્વન્ શોમિરોણ્ગાલીભ્રદ્રેશમધ્યેન ગચ્છતિ,
 12 એતર્હિ કુત્રચિદ્ ગ્રામે પ્રવેશમાત્રે દશકુચ્ચિનસ્તં સાક્ષાત્ કૃત્વા 13 દૂરે
 તિષ્ઠન્નત ઉચ્ચૈ વંકતુમારેભિરે, હે પ્રભો યીશો દયસ્વાસ્માન્ | 14 તતઃ સ
 તાન્ દૃષ્ટ્વા જગાદ, યૂયં યાજકાનાં સમીપે સ્વાન્ દર્શયત, તતસ્તે ગચ્છન્તો
 રોગાત્ પરિષ્કૃતાઃ | 15 તદા તેષામેકઃ સ્વં સ્વસ્થં દૃષ્ટ્વા પ્રોચ્ચૈરીશ્વરં ધન્યં
 વદન્ વ્યાઘુટ્યાયાતો યીશો ગુંગાનનુવદન્ તચ્ચરણાઘોભૂમૌ પપાત; 16 સ
 યાસીત્ શોમિરોણી | 17 તદા યીશુરવદત્, દશજનાઃ કિં ન પરિષ્કૃતાઃ?
 તદ્દાન્યે નવજનાઃ કુત્ર? 18 ઈશ્વરં ધન્યં વદન્તમ્ એનં વિદેશિનં વિના
 કોપ્યન્થો ન પ્રાપ્યત | 19 તદા સ તમુવાચ, ત્વમુત્થાય યાહિ વિશ્વાસસ્તે
 ત્વાં સ્વસ્થં કૃતવાન્ | 20 અથ કદેશ્વરસ્ય રાજત્વં ભવિષ્યતીતિ ક્ષિરૂશિભિઃ
 પૃથ્થે સ પ્રત્યુવાચ, ઈશ્વરસ્ય રાજત્વમ્ ઐશ્વર્યદર્શનેન ન ભવિષ્યતિ |
 21 અત એતસ્મિન્ પશ્ય તસ્મિન્ વા પશ્ય, ઇતિ વાક્યં લોકા વક્તું
 ન શક્ષ્યન્તિ, ઈશ્વરસ્ય રાજત્વં યુષ્માકમ્ અન્તરેવાસ્તે | 22 તતઃ સ
 શિષ્યાન્ જગાદ, યદા યુષ્માભિ મનુજસુતસ્ય દિનમેકં દ્રષ્ટુમ્ વાચ્છિષ્યતે
 કિન્તુ ન દર્શિષ્યતે, ઈદૃક્કાલ આયાતિ | 23 તદાત્ર પશ્ય વા તત્ર પશ્યેતિ
 વાક્યં લોકા વક્ષ્યન્તિ, કિન્તુ તેષાં પશ્ચાત્ મા યાત, માનુગચ્છત ચ | 24
 યતસ્તદિદ્ યથાકાશૈકદિશ્યુદિય તદન્યામપિ દિશં વ્યાપ્ય પ્રકાશતે તદ્દત્
 નિજદિને મનુજસૂનુઃ પ્રકાશિષ્યતે | 25 કિન્તુ તત્પૂર્વ્વં તેનાનેકાનિ દુઃખાનિ
 ભોક્તવ્યાન્યેતદ્વર્ત્તમાનલોકૈશ્ચ સોડવજ્ઞાતવ્યઃ | 26 નોહસ્ય વિધમાનકાલે
 યથાભવત્ મનુષ્યસૂનોઃ કાલેપિ તથા ભવિષ્યતિ | 27 યાવત્કાલં નોહો

मडापोतं नारोड् आऽप्लाविवार्येत्य सव्यं नानाशयय्य तावत्कालं यथा
लोका अभुञ्जतापिवन् व्यवहन् व्यवाहयंश्च; 28 एत्थं लोटो वर्तमानकालेपि
यथा लोका भोजनपानक्यविक्रयरोपणगृहनिर्माणाकर्म्मसु प्रावर्तन्त, 29
किन्तु यदा लोट् सिदोभो निर्जगाम तदा नभसः सगन्धकाग्निवृष्टिर्भूत्वा
सव्यं व्यनाशयत् 30 तद्धन् मानवपुत्रप्रकाशादिनेपि भविष्यति। 31 तदा
यदि कश्चिद् गृहोपरि तिष्ठति तर्हि स गृहमध्यात् किमपि द्रव्यमानेतुम्
अवरुह्य नैतुः यश्च क्षेत्रे तिष्ठति सोऽपि व्याधुत्य नायातु। 32 लोटः पर्णी
स्मरत। 33 यः प्राणान् रक्षितुं चेष्टिष्यते स प्राणान् हारयिष्यति यस्तु
प्राणान् हारयिष्यति सभवे प्राणान् रक्षिष्यति। 34 युष्मानहं वय्मि तस्यां
रात्रौ शय्यैकगतयो लोकायोरेको धारिष्यते परस्त्यक्ष्यते। 35 स्त्रियौ युगपत्
पेषणीं व्यावर्तयिष्यतस्तयोरेका धारिष्यते परात्यक्ष्यते। 36 पुरुषौ क्षेत्रे
स्थास्यतस्तयोरेको धारिष्यते परस्त्यक्ष्यते। 37 तदा ते पप्रच्छुः, हे प्रभो
कुत्रेत्थं भविष्यति? ततः स उवाच, यत्र शवस्तिष्ठति तत्र गृध्रा मिलन्ति।

18 अपरञ्च लोकैरकलान्तैर्निरन्तरं प्रार्थयितव्यम् एत्याशयेन यीशुना
दृष्टान्तं अकथितः। 2 कुत्रयिन्नगरे कश्चित् प्राड्विवाक आसीत् स
एश्वरान्नाभिभेत् मानुषांश्च नामन्यत। 3 अथ तत्पुरवासिनी कायिद्विधवा
तत्समीपमेत्य विवादिना सह मम विवाहं परिष्कुर्विति निवेदयामास। 4
ततः स प्राड्विवाकः कियद्दिनानि न तदङ्गीकृतवान् पश्चाच्चित्ते यिन्तयामास,
यद्यपीश्वरान्नाभिभेमि मनुष्यान्पि न मन्ये 5 तथाप्येषा विधवा मां
क्लिशनाति तस्मादस्या विवाहं परिष्करिष्यामि नोयेत् सा सदागत्य मां
व्यग्रं करिष्यति। 6 पश्चात् प्रभुरवदद् असावन्यायप्राड्विवाको यदाह तत्र
मनो निधध्वं। 7 एश्वरस्य ये ऽभिरुच्यितलोका दिवानिशं प्रार्थयन्ते स
बहुदिनानि विलम्ब्यापि तेषां विवादान् किं न परिष्करिष्यति? 8 युष्मानहं
वदामि त्वरया परिष्करिष्यति, किन्तु यदा मनुष्यपुत्र आगमिष्यति तदा
पृथिव्यां किमीदृशं विश्वासं प्राप्स्यति? 9 ये स्वान् धार्मिकान् ज्ञात्वा
परान् तुच्छीकुर्वन्ति अतादृग्भ्यः, कियद्भ्य एभं दृष्टान्तं कथयामास।
10 अकथितः किञ्चेश्वरः करसञ्जायी द्वाविमौ प्रार्थयितुं मन्दिरं गतौ। 11
ततोऽसौ किञ्चेश्वरः कियद्भ्यो तिष्ठन् हे एश्वर अहमन्यलोकवत् लोठयितान्यायी
पारदारिकश्च न भवामि अस्य करसञ्जायिनस्तुल्यश्च न, तस्मात्त्वां धन्यं

વદામિ | 12 સપ્તસુ દિનેષુ દિનદ્વયમુપવસામિ સર્વસમ્પત્તે દેશમાંશં દદામિ
 ચ, એતત્કથાં કથયન્ પ્રાર્થયામાસ | 13 કિન્તુ સ કરસઆયિ દૂરે તિષ્ઠન્
 સ્વર્ગં દ્રષ્ટું નેચ્છન્ વક્ષસિ કરાઘાતં કુર્વન્ હે ઈશ્વર પાપિષ્ઠં માં દયસ્વ, ઇત્યં
 પ્રાર્થયામાસ | 14 યુષ્માનહં વદામિ, તયોર્દ્વયો મધ્યે કેવલઃ કરસઆયી
 પુણ્યવત્ત્વેન ગણિતો નિજગૃહં જગામ, યતો યઃ કશ્ચિત્ સ્વમુન્નમયતિ
 સ નામયિષ્યતે કિન્તુ યઃ કશ્ચિત્ સ્વં નમયતિ સ ઉન્નમયિષ્યતે | 15
 અથ શિશૂનાં ગાત્રસ્પર્શાર્થં લોકાસ્તાન્ તસ્ય સમીપમાનિન્યુઃ શિષ્યાસ્તદ્
 દૃષ્ટ્વાનેતૃન્ તર્જયામાસુઃ, 16 કિન્તુ યીશુસ્તાનાહૂય જગાદ, મન્નિકટમ્
 આગન્તું શિશૂન્ અનુજાનીધ્વં તાંશ્ર મા વારયત; યત ઈશ્વરરાજ્યાધિકારિણ
 એષાં સદૃશાઃ | 17 અહં યુષ્માન્ યથાર્થં વદામિ, યો જનઃ શિશોઃ સદૃશો
 ભૂત્વા ઈશ્વરરાજ્યં ન ગૃહ્ણાતિ સ કેનાપિ પ્રકારેણ તત્ પ્રવેષ્ટું ન શકનોતિ | 18
 અપરમ્ એકોધિપતિસ્તં પપ્રચ્છ, હે પરમગુરો, અનન્તાયુષઃ પ્રાપ્તયે મયા કિં
 કર્તવ્યં? (aiōnios g166) 19 યીશુરુવાચ, માં કુતઃ પરમં વદસિ? ઈશ્વરં વિના
 કોપિ પરમો ન ભવતિ | 20 પરદારાન્ મા ગચ્છ, નરં મા જહિ, મા ચોરય,
 મિથ્યાસાક્ષ્યં મા દેહિ, માતરં પિતરઞ્ચ સંમન્યસ્વ, એતા યા આજ્ઞાઃ સન્તિ
 તાસ્ત્વં જાનાસિ | 21 તદા સ ઉવાચ, બાલ્યકાલાત્ સર્વા એતા આચરામિ |
 22 ઇતિ કથાં શ્રુત્વા યીશુસ્તમવદત્, તથાપિ તવૈકં કર્મ ન્યૂનમાસ્તે,
 નિજં સર્વસ્વં વિક્રીય દરિદ્રેભ્યો વિતર, તસ્માત્ સ્વર્ગે ધનં પ્રાપ્સ્યસિ;
 તત આગત્ય મમાનુગામી ભવ | 23 કિન્ત્વેતાં કથાં શ્રુત્વા સોધિપતિઃ
 શુશોચ, યતસ્તસ્ય બહુધનમાસીત્ | 24 તદા યીશુસ્તમતિશોકાન્વિતં દૃષ્ટ્વા
 જગાદ, ધનવતામ્ ઈશ્વરરાજ્યપ્રવેશઃ કીદૃગ્ દુષ્કરઃ | 25 ઈશ્વરરાજ્યે
 ધનિનઃ પ્રવેશાત્ સૂચેશ્ચિદ્રેણ મહાજ્ઞસ્ય ગમનાગમને સુકરે | 26 શ્રોતારઃ
 પપ્રચ્છુસ્તર્હિ કેન પરિત્રાણં પ્રાપ્સ્યતે? 27 સ ઉક્તવાન્, યન્ માનુષેણાશક્યં
 તદ્ ઈશ્વરેણ શક્યં | 28 તદા પિતર ઉવાચ, પશ્ય વયં સર્વસ્વં પરિત્યજ્ય
 તવ પશ્ચાદ્દામિનોડભવામ | 29 તતઃ સ ઉવાચ, યુષ્માનહં યથાર્થં વદામિ,
 ઈશ્વરરાજ્યાર્થં ગૃહં પિતરૌ ભ્રાતૃગણં જાયાં સન્તાનાંશ્ચ ત્યક્તવા 30 ઇહ
 કાલે તતોડધિકં પરકાલે ડનન્તાયુશ્ચ ન પ્રાપ્સ્યતિ લોક ઈદૃશઃ કોપિ નાસ્તિ |
 (aiōn g165, aiōnios g166) 31 અનન્તરં સ દ્વાદશશિષ્યાનાહૂય બભાષે,
 પશ્યત વયં યિરૂશાલમ્નગરં યામઃ, તસ્માત્ મનુષ્યપુત્રે ભવિષ્યદ્દાદિભિરુક્તં

यदस्ति तदनुभूयं तं प्रति घटिष्यते; 32 वस्तुतस्तु सोऽन्यदेशीयानां हस्तेषु
समर्पयिष्यते, ते तमुपलसिष्यन्ति, अन्यायमायरिष्यन्ति तद्रूपि निष्ठीवं
निक्षेप्यन्ति, कशाभिः प्रहृत्य तं हनिष्यन्ति य, 33 किन्तु तृतीयदिने स
श्मशानाद् उत्थास्यति | 34 अतस्याः कथाया अभिप्रायं किञ्चिदपि ते बोद्धुं
न शक्नुः तेषां निकटेऽस्यष्टतवात् तस्यैतासां कथानाम् आशयं ते ज्ञातुं न
शक्नुश्च | 35 अथ तस्मिन् विरीडोः पुरस्यान्तिकं प्राप्ते कश्चिदन्धः पथः पार्श्वं
उपविश्य भिक्षाम् अकरोत् 36 स लोकसमूहस्य गमनशब्दं श्रुत्वा तत्कारणं
पृष्टवान् | 37 नासरतीययीशुर्यातीति लोकैरुक्ते स उच्यैर्वक्तुमारेत्मे, 38
हे दायूदः सन्तान यीशो मां दयस्व | 39 ततोऽगामिनस्तं मौनी तिष्ठेति
तर्जयामासुः किन्तु स पुनारुवन् उवाच, हे दायूदः सन्तान मां दयस्व | 40
तदा यीशुः स्थगितो भूत्वा स्वान्तिके तमानेतुम् आदिदेश | 41 ततः स
तस्यान्तिकम् आगतत्, तदा स तं पप्रच्छ, त्वं किमिच्छसि? त्वदर्थमहं किं
करिष्यामि? स उक्तवान्, हे प्रभोऽहं द्रष्टुं लभै | 42 तदा यीशुरुवाच,
दृष्टिशक्तिं गृह्णाण तव प्रत्ययस्त्वां स्वस्थं कृतवान् | 43 ततस्तत्क्षणात्
तस्य यक्षुषी प्रसन्ने; तस्मात् स ईश्वरं धन्यं वदन् तत्पश्चाद् ययौ,
तदालोक्य सर्वे लोका ईश्वरं प्रशंसितुम् आरेभिरे |

19 यदा यीशु विरीडोपुरं प्रविश्य तन्मध्येन गच्छंस्तदा 2 सक्केयनामा
करसञ्जायिनां प्रधानो धनवानेको 3 यीशुः कीदृगिति द्रष्टुं चेष्टितवान् किन्तु
भर्त्वालोकासंधमध्ये तद्दर्शनमप्राप्य 4 येन पथा स यास्यति तत्पथेऽग्रे
धावित्वा तं द्रष्टुम् उडुम्बरतरुमारुरोह | 5 पश्चाद् यीशुस्तत्स्थानम् एत्वा
उर्द्ध्वं विलोक्य तं दृष्ट्वावादीत्, हे सक्केय त्वं शीघ्रमवरोह मयाध त्वद्रेहे
वस्तव्यं | 6 ततः स शीघ्रमवरुह्य साह्लाहं तं जग्राह | 7 तद् दृष्ट्वा सर्वे
विवदमाना वक्तुमारेभिरे, सोतिथित्वेन दृष्टलोकगृहं गच्छति | 8 किन्तु
सक्केयो दण्डायमानो वक्तुमारेत्मे, हे प्रभो पश्य मम या सम्पत्तिरस्ति
तदद्दं दरिद्रेभ्यो ददे, अपरम् अन्यायं कृत्वा कस्मादपि यद्वि कदापि
किञ्चित् मया गृहीतं तर्हि तय्यतुर्गुणं ददामि | 9 तदा यीशुस्तमुक्तवान्
अयमपि एव्राहीमः सन्तानोऽतः कारणाद् अधास्य गृहे त्राणमुपस्थितं |
10 यद् हारितं तत् मृगयितुं रक्षितुञ्च मनुष्यपुत्र आगतवान् | 11
अथ स यिज्ञशास्यः समीप उपातिष्ठद् ईश्वरराजत्वस्यानुष्ठानं तदैव

ભવિષ્યતીતિ લોકૈરન્વભૂયત, તસ્માત્ સ શ્રોતૃભ્યઃ પુનર્દૃષ્ટાન્તકથામ્ ઉત્થાપ્ય
કથયામાસ | 12 કોપિ મહાલ્લોકો નિજાર્થં રાજત્વપદં ગૃહીત્વા પુનરાગન્તું
દૂરદેશં જગામ | 13 યાત્રાકાલે નિજાન્ દશદાસાન્ આહૂય દશસ્વાર્ણમુદ્રા
દત્વા મમાગમનપર્યન્તં વાણિજ્યં કુરુતેત્યાદિદેશ | 14 કિન્તુ તસ્ય
પ્રજાસ્તમવજ્ઞાય મનુષ્યમેનમ્ અસ્માકમુપરિ રાજત્વં ન કારયિવ્યામ ઇમાં
વાર્તાં તન્નિકટે પ્રેરયામાસુઃ | 15 અથ સ રાજત્વપદં પ્રાપ્યાગતવાન્ એકૈકો
જનો બાણિજ્યેન કિં લબ્ધવાન્ ઇતિ જ્ઞાતું યેષુ દાસેષુ મુદ્રા અર્પયત્ તાન્
આહૂયાનેતુમ્ આદિદેશ | 16 તદા પ્રથમ આગત્ય કથિતવાન્ હે પ્રભો તવ
તથૈકયા મુદ્રયા દશમુદ્રા લબ્ધાઃ | 17 તતઃ સ ઉવાચ ત્વમુત્તમો દાસઃ સ્વલ્પેન
વિશ્વાસ્યો જાત ઇતઃ કારણાત્ ત્વં દશનગરાણામ્ અધિપો ભવ | 18
દ્વિતીય આગત્ય કથિતવાન્ હે પ્રભો તવૈકયા મુદ્રયા પચ્ચમુદ્રા લબ્ધાઃ | 19
તતઃ સ ઉવાચ, ત્વં પચ્ચાનાં નગરાણામધિપતિ ભવ | 20 તતોન્ય આગત્ય
કથયામાસ, હે પ્રભો પશ્ય તવ યા મુદ્રા અહં વસ્ત્રે બદ્ધ્વાસ્થાપયં સેયં |
21 ત્વં કૃપણો યન્નાસ્થાપયસ્તદપિ ગૃહ્ણાસિ, યન્નાવપસ્તદેવ ચ છિન્ત્સિ
તતોહં ત્વત્તો ભીતઃ | 22 તદા સ જગાદ, રે દુષ્ટદાસ તવ વાક્યેન ત્વાં
દોષિણં કરિષ્યામિ, યદહં નાસ્થાપયં તદેવ ગૃહ્ણામિ, યદહં નાવપચ્ચ તદેવ
છિન્ત્સિ, એતાદૃશઃ કૃપણોહમિતિ યદિ ત્વં જાનાસિ, 23 તર્હિ મમ મુદ્રા
બાણિજ્યં નિકટે કુતો નાસ્થાપયઃ? તયા કૃતેડહમ્ આગત્ય કુસીદેન સાર્દ્ધં
નિજમુદ્રા અપ્રાપ્સ્યમ્ | 24 પચ્ચાત્ સ સમીપસ્થાન્ જનાન્ આજ્ઞાપયત્
અસ્માત્ મુદ્રા આનીય યસ્ય દશમુદ્રાઃ સન્તિ તસ્મૈ દત્ત | 25 તે પ્રોયુઃ
પ્રભોડસ્ય દશમુદ્રાઃ સન્તિ | 26 યુષ્માનહં વદામિ યસ્યાશ્રયે વદ્ધતે ડધિકં
તસ્મૈ દાયિષ્યતે, કિન્તુ યસ્યાશ્રયે ન વદ્ધતે તસ્ય યદ્દદસ્તિ તદપિ તસ્માન્
નાયિષ્યતે | 27 કિન્તુ મમાધિપતિત્વસ્ય વશત્વે સ્થાતુમ્ અસમ્મન્યમાના યે
મમ રિપવસ્તાનાનીય મમ સમક્ષં સંહરત | 28 ઇત્યુપદેશકથાં કથયિત્વા
સોગ્રઃ સન્ ચિરુશાલમપુરં યયૌ | 29 તતો ભૈત્કંગીબૈથનીયાગ્રામયોઃ સમીપે
જૈતુનાદ્રેરન્તિકમ્ ઇત્વા શિષ્યદ્વયમ્ ઇત્યુક્ત્વા પ્રેષયામાસ, 30 યુવામમું
સમ્મુખસ્થગ્રામં પ્રવિશ્યૈવ યં કોપિ માનુષઃ કદાપિ નારોહત્ તં ગર્દભશાવકં
બદ્ધં દ્રક્ષ્યથસ્તં મોચયિત્વાનયતં | 31 તત્ર કુતો મોચયથઃ? ઇતિ ચેત્ કોપિ
વક્ષ્યતિ તર્હિ વક્ષ્યથઃ પ્રભેરત્ર પ્રયોજનમ્ આસ્તે | 32 તદા તૌ પ્રરિતૌ ગત્વા

તત્કથાનુસારેણ સર્વ્ય પ્રાપ્તૌ | 33 ગર્દભશાવકમોચનકાલે તત્વામિન ઊચુઃ,
 ગર્દભશાવકં કુતો મોચયથઃ? 34 તાવૂચતુઃ પ્રભોરત્ર પ્રયોજનમ્ આસ્તે |
 35 પશ્ચાત્ તૌ તં ગર્દભશાવકં યીશોરન્તિકમાનીય તત્પૃષ્ઠે નિજવસનાનિ
 પાતયિત્વા તદ્દુપરિ યીશુમારોહયામાસતુઃ | 36 અથ યાત્રાકાલે લોકાઃ પથિ
 સ્વવસ્ત્રાણિ પાતયિતુમ્ આરેભિરે | 37 અપરં જૈતુનાદ્રેરુપત્યકામ્ ઇત્વા
 શિષ્યસંઘઃ પૂર્વ્યદૃષ્ટાનિ મહાકર્માણિ સ્મૃત્વા, 38 યો રાજા પ્રભો નામ્નાયાતિ
 સ ધન્યઃ સ્વર્ગે કુશલં સર્વ્યોચ્યે જયધ્વનિ ભવતુ, કથામેતાં કથયિત્વા
 સાનન્દમ્ ઉચૈરીશ્વરં ધન્યં વક્તુમારેભે | 39 તદા લોકારણ્યમધ્યસ્થાઃ કિચન્તઃ
 ક્ષિરુશિનસ્તત્ શ્રુત્વા યીશું પ્રોચુઃ, હે ઉપદેશક સ્વશિષ્યાન્ તર્જય | 40 સ
 ઉવાચ, યુષ્માનહં વદામિ યધમી નીરવાસ્તિષ્ઠન્તિ તર્હિ પાષાણા ઉચૈઃ કથાઃ
 કથયિષ્યન્તિ | 41 પશ્ચાત્ તત્પુરાન્તિકમેત્ય તદવલોક્ય સાશ્રુપાતં જગાદ,
 42 હા હા ચેત્ ત્વમગ્રેડઙ્ગાસ્યથાઃ, તવાસ્મિન્નેવ દિને વા યદિ સ્વમજ્જલમ્
 ઉપાલપ્સ્યથાઃ, તર્હ્યુત્તમમ્ અભવિષ્યત્, કિન્તુ ક્ષણેસ્મિન્ તત્તવ દૃષ્ટેરગોચરમ્
 ભવતિ | 43 ત્વં સ્વત્રાણકાલે ન મનો ન્યધત્થા ઇતિ હેતો ર્યત્કાલે તવ
 રિપવસ્ત્વાં ચતુર્દિક્ષુ પ્રાયીરેણ વેષ્ટયિત્વા રોત્સ્યન્તિ 44 બાલકૈઃ સાર્દ્ધં
 ભૂમિસાત્ કરિષ્યન્તિ ચ ત્વન્મધ્યે પાષાણૈકોપિ પાષાણોપરિ ન સ્થાસ્યતિ
 ચ, કાલ ઇદૃશ ઉપસ્થાસ્યતિ | 45 અથ મધ્યેમન્દિરં પ્રવિશ્ય તત્રત્યાન્
 ક્ષયિવિક્ષિણો બહિષ્કુર્વન્ 46 અવદત્ મદ્દહં પ્રાર્થનાગૃહમિતિ લિપિરાસ્તે
 કિન્તુ યૂયં તદેવ ચૈરાણાં ગહ્નરં કુરુથ | 47 પશ્ચાત્ સ પ્રત્યહં મધ્યેમન્દિરમ્
 ઉપદિદેશઃ; તતઃ પ્રધાનયાજકા અધ્યાપકાઃ પ્રાયીનાશ્ચ તં નાશયિતું ચિયેષ્ટિરે;
 48 કિન્તુ તદ્દુપદેશે સર્વ્યે લોકા નિવિષ્ટયિતાઃ સ્થિતાસ્તસ્માત્ તે તત્કર્તુ
 નાવકાશં પ્રાપુઃ |

20 અથૈકદા યીશુ મ્નિદરે સુસંવાદં પ્રચારયન્ લોકાનુપદિશતિ, એતર્હિ
 પ્રધાનયાજકા અધ્યાપકાઃ પ્રાત્રશ્ચ તન્નિકટમાગત્ય પપ્રચ્છુઃ 2 કયાઙ્ગયા
 ત્વં કર્માણ્યેતાનિ કરોષિ? કો વા ત્વામાઙ્ગાપયત્? તદસ્માન્ વદ | 3 સ
 પ્રત્યુવાચ, તર્હિ યુષ્માનપિ કથામેકાં પૃચ્છામિ તસ્યોત્તરં વદત | 4 ચોહનો
 મજ્જનમ્ ઇશ્વરસ્ય માનુષાણાં વાઙ્ગાતો જાતં? 5 તતસ્તે મિથો વિવિચ્ય
 જગદ્ગુઃ, યદીશ્વરસ્ય વદામસ્તર્હિ તં કુતો ન પ્રત્યૈત સ ઇતિ વક્ષ્યતિ | 6
 યદિ મનુષ્યસ્યેતિ વદામસ્તર્હિ સર્વ્યે લોકા અસ્માન્ પાષાણૈ હ્નિષ્યન્તિ

यतो योऽन् भविष्यद्वाहीति सव्यं दृढं जानन्ति। 7 अतश्चेव ते प्रत्यूयुः
 कस्याज्ञया जातम् एति वक्तुं न शक्नुमः। 8 तदा यीशुरवदत् तर्हि कयाज्ञया
 कर्माण्येताति करोमीति य युष्मान् न वक्ष्यामि। 9 अथ लोकानां साक्षात् स
 एमां दृष्टान्तकथां वक्तुमारेत्ते, कश्चिद् द्राक्षाक्षेत्रं कृत्वा तत् क्षेत्रं कृषीवलानां
 हस्तेषु समर्थं बहुकालार्थं दूरदेशं जगाम। 10 अथ इलकाले इलानि ग्रहीतु
 कृषीवलानां समीपे दासं प्राडिणोत् किन्तु कृषीवलास्तं प्रहृत्य रिक्तहस्तं
 विससर्जुः। 11 ततः सोधिपतिः पुनरन्यं दासं प्रेषयामास, ते तमपि प्रहृत्य
 कुव्यवहृत्य रिक्तहस्तं विससृजुः। 12 ततः स तृतीयवारम् अन्यं प्राडिणोत्
 ते तमपि क्षताङ्गं कृत्वा बहिर्निष्क्रिपुः। 13 तदा क्षेत्रपतिर्वियारयामास,
 भमेदानीं किं कर्तव्यं? मम प्रिये पुत्रे प्रहिते ते तमवश्यं दृष्ट्वा समादरिष्यन्ते।
 14 किन्तु कृषीवलास्तं निरीक्ष्य परस्परं विविच्य प्रोयुः, अयमुत्तराधिकारी
 आगच्छतैनं हन्मस्ततोधिकारोस्माकं भविष्यति। 15 ततस्ते तं क्षेत्राद् बहिर्
 निर्पात्य जघ्नुस्तस्मात् स क्षेत्रपतिस्तान् प्रति किं करिष्यति? 16 स आगत्य
 तान् कृषीवलान् हत्वा परेषां हस्तेषु तत्क्षेत्रं समर्पयिष्यति; एति कथां
 श्रुत्वा ते ऽवदन् अेतादृशी घटना न भवतु। 17 किन्तु यीशुस्तानवलोक्य
 जगाद, तर्हि, स्थपतयः करिष्यन्ति ग्रावाणं यन्तु तुच्छकं। प्रधानप्रस्तरः
 कोऽो स अेव हि भविष्यति। अेतस्य शास्त्रीयवयनस्य किं तात्पर्यं? 18
 अपरं तत्पाषाणोपरि यः पतिष्यति स भक्ष्यते किन्तु यस्योपरि स पाषाणः
 पतिष्यति स तेन धूलिवयं यूर्णोभविष्यति। 19 सोस्माकं विरुद्धं दृष्टान्तमिमं
 कथितवान् एति ज्ञात्वा प्रधानयाजका अध्यापकाश्च तदैव तं धर्तुं ववाञ्छुः
 किन्तु लोकेभ्यो बिल्युः। 20 अतश्चेव तं प्रति सतर्काः सन्तः कथं तद्वाक्यदोषं
 धृत्वा तं देशाधिपस्य साधुवेशधारिणश्चरान् तस्य समीपे प्रेषयामासुः।
 21 तदा ते तं पप्रच्छुः, हे उपदेशक भवान् यथार्थं कथयन् उपदिशति,
 कमध्यनपेक्ष्य सत्यत्वेनैश्वरं मार्गमुपदिशति, वयमेतज्जानीमः। 22
 कैसरराजाय करोस्माभिर्दियो न वा? 23 स तेषां वञ्चनं ज्ञात्वावदत् कुतो मां
 परीक्षध्वे? मां मुद्रामेकं दर्शयत। 24 एह लिप्पिता मूर्तिरियं नाम य कस्य?
 तेऽवदन् कैसरस्य। 25 तदा स उवाच, तर्हि कैसरस्य द्रव्यं कैसराय दत्तः
 एश्वरस्य तु द्रव्यमीश्वराय दत्त। 26 तस्माद्लोकानां साक्षात् तत्कथायाः
 कमपि दोषं धर्तुमप्राप्य ते तस्योत्तराद् आश्चर्यं मन्यमाना मौनिनस्तस्थुः।

27 અપરઞ્ચ શ્મશાનાદુત્થાનાનઙ્ગીકારિણાં સિદ્ધકિનાં કિયન્તો જના આગત્ય તં પપ્રચ્છુઃ, 28 હે ઉપદેશક શાસ્ત્રે મૂસા અસ્માન્ પ્રતીતિ લિલોખ યસ્ય ભ્રાતા ભાર્ય્યાયાં સત્યાં નિઃસન્તાનો મિયતે સ તજજાયાં વિવહ્ય તદ્વંશમ્ ઉત્પાદયિષ્યતિ | 29 તથાય કેચિત્ સપ્ત ભ્રાતર આસન્ તેષાં જ્યેષ્ઠો ભ્રાતા વિવહ્ય નિરપત્યઃ પ્રાણાન્ જહૌ | 30 અથ દ્વિતીયસ્તસ્ય જાયાં વિવહ્ય નિરપત્યઃ સન્ મમાર | તૃતીયશ્ચ તામેવ વ્યુવાહ; 31 ઇત્યં સપ્ત ભ્રાતરસ્તામેવ વિવહ્ય નિરપત્યાઃ સન્તો મમ્નુઃ | 32 શેષે સા સ્ત્રી ય મમાર | 33 અતએવ શ્મશાનાદુત્થાનકાલે તેષાં સપ્તજનાનાં કસ્ય સા ભાર્ય્યા ભવિષ્યતિ? યતઃ સા તેષાં સપ્તાનામેવ ભાર્ય્યાસીત્ | 34 તદા યીશુઃ પ્રત્યુવાય, એતસ્ય જગતો લોકા વિવહન્તિ વાગ્દત્તાશ્ચ ભવન્તિ (aiōn g165) 35 કિન્તુ યે તજજગત્પ્રાપ્તિયોગ્યત્વેન ગણિતાં ભવિષ્યન્તિ શ્મશાનાચ્ચોત્થાસ્યન્તિ તે ન વિવહન્તિ વાગ્દત્તાશ્ચ ન ભવન્તિ, (aiōn g165) 36 તે પુનર્ન મિયન્તે કિન્તુ શ્મશાનાદુત્થાપિતાઃ સન્ત ઈશ્વરસ્ય સન્તાનાઃ સ્વર્ગીયદૂતાનાં સદૃશાશ્ચ ભવન્તિ | 37 અધિકન્તુ મૂસાઃ સ્તમ્બોપાખ્યાને પરમેશ્વર ઈબ્રાહીમ ઈશ્વર ઈસ્હાક ઈશ્વરો યાકૂબશ્ચેશ્વર ઇત્યુક્ત્વા મૃતાનાં શ્મશાનાદ્ ઉત્થાનસ્ય પ્રમાણં લિલોખ | 38 અતએવ ય ઈશ્વરઃ સ મૃતાનાં પ્રભુર્ન કિન્તુ જીવતામેવ પ્રભુઃ, તન્નિકટે સર્વે જીવન્તઃ સન્તિ | 39 ઇતિ શ્રુત્વા કિયન્તોઘ્યાપકા ઊચુઃ, હે ઉપદેશક ભવાન્ ભદ્રં પ્રત્યુક્તવાન્ | 40 ઇતઃ પરં તં કિમપિ પ્રષ્ટં તેષાં પ્રગલ્ભતા નાભૂત્ | 41 પશ્ચાત્ સ તાન્ ઉવાચ, યઃ શ્રીષ્ટઃ સ દાયૂદઃ સન્તાન એતાં કથાં લોકાઃ કથં કથયન્તિ? 42 યતઃ મમ પ્રભુમિદં વાક્યમવદત્ પરમેશ્વરઃ | તવ શત્રૂનહં યાવત્ પાદપીઠં કરોમિ ન | તાવત્ કાલં મદીયે ત્વં દક્ષપાર્શ્વ ઉપાવિશ | 43 ઇતિ કથાં દાયૂદ્ સ્વયં ગીતગ્રન્થેડવદત્ | 44 અતએવ યદિ દાયૂદ્ તં પ્રભું વદતિ, તર્હિ સ કથં તસ્ય સન્તાનો ભવતિ? 45 પશ્ચાદ્ યીશુઃ સર્વજનાનાં કર્ણગોચરે શિષ્યાનુવાચ, 46 યેડઘ્યાપકા દીર્ઘપરિચ્છદં પરિધાય ભ્રમન્તિ, હટ્ટાપણયોર્નમસ્કારે ભજનગૃહસ્ય પ્રોચ્યાસને ભોજનગૃહસ્ય પ્રધાનસ્થાને ય પ્રીયન્તે 47 વિધવાનાં સર્વસ્વં ગ્રસિત્વા છલેન દીર્ઘકાલં પ્રાર્થયન્તે ય તેષુ સાવધાના ભવત, તેષામુગ્રદણ્ડો ભવિષ્યતિ |

21 अथ धनिलोका भाण्डागारे धनं निक्षिपन्ति स तदेव पश्यति, 2
 अतर्हि कायिदीना विधवा पण्डितं निक्षिपति तद् ददर्श। 3 ततो यीशुरुवाच
 युष्मानहं यथार्थं वदामि, दरिद्रेयं विधवा सर्व्वेभ्योधिकं न्यक्षेप्सीत्, 4
 यतोन्चे स्वप्राज्यधनेभ्य इश्वराय किञ्चित् न्यक्षेप्सुः, किन्तु दरिद्रेयं विधवा
 दिनयापनार्थं स्वस्य यत् किञ्चित् स्थितं तत् सर्व्वं न्यक्षेप्सीत्। 5 अपरञ्च
 उत्तमप्रस्तरैरुत्सृष्ट्यैश्च मन्दिरं सुशोभतेतरां कैश्चिदित्युक्ते स प्रत्युवाच 6
 यूयं यद्विदं निययनं पश्यथ, अस्य पाषाणैकोप्यन्यपाषाणोपरि न स्थास्यति,
 सर्व्वे भूसाद्भविष्यन्ति कालोयमायाति। 7 तदा ते पप्रच्छुः, हे गुरो
 घटनेदृशी कदा भविष्यति? घटनाया अतस्यसश्चिह्नं वा किं भविष्यति?
 8 तदा स जगाद, सावधाना भवत यथा युष्माकं भ्रमं कोपि न जनयति,
 भीष्टोडमित्युक्त्वा मम नाम्ना बहव उपस्थास्यन्ति स कालः प्रायेणोपस्थितः,
 तेषां पश्चान्मा गच्छत। 9 युद्धस्योपप्लवस्य य वार्त्ता श्रुत्वा मा शङ्कध्वं,
 यतः प्रथमम् अेता घटना अवश्यं भविष्यन्ति किन्तु नापाते युगान्तो
 भविष्यति। 10 अपरञ्च कथयामास, तदा देशस्य विपक्षत्वेन देशो राज्यस्य
 विपक्षत्वेन राज्यम् उत्थास्यति, 11 नानास्थानेषु मडाभूकम्पो दृढिक्षं मारी
 य भविष्यन्ति, तथा व्योमभाण्डलस्य भयङ्करदर्शनान्यश्चर्य्यलक्षणानि य
 प्रकाशयिष्यन्ते। 12 किन्तु सर्व्वसाभेतासां घटनानां पूर्व्वं लोका युष्मान्
 धृत्वा ताडयिष्यन्ति, भजनालये कारायाञ्च समर्पयिष्यन्ति मम नामकारणाद्
 युष्मान् भूपानां शासकानाञ्च सम्भुषं नेष्यन्ति य। 13 साक्ष्यार्थम् अेतानि
 युष्मान् प्रति घटिष्यन्ते। 14 तदा किमुत्तरं वक्तव्यम् अेतत् न यिन्तयिष्याम
 इति मनःसु निश्चितनुत। 15 विपक्षा यस्मात् किमप्युत्तरम् आपत्तिञ्च कर्त्तुं न
 शक्यन्ति तादृशं वाक्पटुत्वं ज्ञानञ्च युष्मभ्यं दास्यामि। 16 किञ्च यूयं पित्रा
 मात्रा मात्रा बन्धुना ज्ञात्या कुटुम्बेन य परकरेषु समर्पयिष्यध्वे; ततस्ते
 युष्माकं कञ्चन कञ्चन धातयिष्यन्ति। 17 मम नाम्नः कारणात् सर्व्वे भनुष्यै
 र्यूयम् ऋतीयिष्यध्वे। 18 किन्तु युष्माकं शिरःकेशैकोपि न विनक्ष्यति, 19
 तस्मादेव धैर्य्यमवलम्ब्य स्वस्वप्राणान् रक्षत। 20 अपरञ्च यिउशालम्पुरं
 सैन्यवेष्टितं विलोक्य तस्योच्छिन्नतायाः समयः समीप इत्यवगमिष्यथ।
 21 तदा यिडूदादेशस्था लोकाः पर्व्वतं पलायन्तां, ये य नगरे तिष्ठन्ति ते
 देशान्तरं पलायन्ता, ये य ग्रामे तिष्ठन्ति ते नगरं न प्रविशन्तु, 22 यतस्तदा

समुचितदण्डनाय धर्मपुस्तके यानि सर्वाणि लिखितानि तानि सङ्गानि
 भविष्यन्ति। 23 किन्तु या यास्तदा गर्भवत्यः स्तन्यदाव्यश्च तामां दुर्गति
 र्भविष्यति, यत ओताल्लोकान् प्रति कोपो देशे य विषमदुर्गति र्घटिष्यते।
 24 वस्तुतस्तु ते ऋद्धारपरिव्वङ्गं लप्स्यन्ते अद्धाः सन्तः सर्वदेशेषु
 नायिष्यन्ते य किञ्चान्यदेशीयानां समयोपस्थितिपर्यन्तं यिदृशालम्भुरं
 तैः पदतलै र्दलयिष्यते। 25 सूर्ययन्त्रनक्षत्रेषु लक्षणादि भविष्यन्ति,
 भुवि सर्वदेशीयानां दुःखं यिन्ता य सिन्धौ वीचीनां तर्जनं गर्जनञ्च
 भविष्यन्ति। 26 भूभौ भाविघटनां यिन्तयित्वा मनुजा भियामृतकल्या
 भविष्यन्ति, यतो व्योममण्डले तेजस्विनो दौलायमाना भविष्यन्ति। 27
 तदा पराक्रमेणा मघतेजसा य मेघाद्भं मनुष्यपुत्रम् आयान्तं द्रक्ष्यन्ति। 28
 किन्वेतासां घटनानामारम्भे सति यूयं मस्तकान्युत्तोल्य उर्ध्वं द्रक्ष्यथ,
 यतो युष्माकं मुक्तेः कालः सविधो भविष्यति। 29 ततस्तेनैतदृष्टान्तकथा
 कथिता, पश्यत उदुम्बरादिवृक्षाणां 30 नवीनपत्राणि जातानीति दृष्ट्वा
 निदावकाल उपस्थित इति यथा यूयं ज्ञातुं शक्नुथ, 31 तथा सर्वासामासां
 घटनानाम् आरम्भे दृष्टे सतीश्वरस्य राजत्वं निकटम् इत्यपि ज्ञास्यथ। 32
 युष्मानन्दं यथार्थं वदामि, विद्यमानलोकानामेषां गमनात् पूर्वम् अेतानि
 घटिष्यन्ते। 33 नभोभुवोर्लोपो भविष्यति मम वाक् तु कदापि लुप्ता न
 भविष्यति। 34 अतश्चैव विषमाशनेन पानेन य सांभारिकयिन्ताभिश्च
 युष्माकं यित्तेषु मत्तेषु तद्दिनम् अकस्माद् युष्मान् प्रति यथा नोपतिष्ठति
 तदर्थं स्वेषु सावधानास्तिष्ठत। 35 पृथिवीस्थसर्वलोकान् प्रति तद्दिनम्
 उन्माथ इव उपस्थास्यति। 36 यथा यूयम् अेतद्भाविघटना उत्तर्तुं
 मनुजसुतस्य सम्भुषे संस्थातुञ्च योग्या भवथ कारणादस्मात् सावधानाः
 सन्तो निरन्तरे प्रार्थयध्वं। 37 अपरञ्च स दिवा मन्दिर उपदिश्य राशै
 जैतुनाद्रिं गत्वातिष्ठत्। 38 ततः प्रत्युषे लाकास्तत्कथां श्रोतुं मन्दिरे तदन्तिकम्
 आगच्छन्।

22 अपरञ्च किण्वशून्यपूपोत्सवस्य काल उपस्थिते 2 प्रधानयाजका
 अध्यायकाश्च यथा तं उन्तुं शक्नुवन्ति तथोपायाम् अयेष्टन्त किन्तु लोकेभ्यो
 भिभ्युः। 3 अेतस्तिन् समये द्वादशशिष्येषु गणित ईश्वरियोतीयद्दिमान्
 यो यिदूदास्तस्यान्तःकराणां शैतानाश्रितत्वात् 4 स गत्वा यथा यीशुं तेषां

करेषु समर्पयितुं शक्नोति तथा मन्त्राणां प्रधानयाजकैः सेनापतिभिश्च सह
 यकार। 5 तेन ते तुष्टास्तस्मै मुद्रां दातुं पापं यक्नुः। 6 ततः सोऽङ्गीकृत्य यथा
 लोडानामगोयरे तं परकरेषु समर्पयितुं शक्नोति तथावकाशं येष्टितुमारेभे।
 7 अथ क्रिएवशून्यपूपोत्भवदिने, अर्थात् यस्मिन् दिने निस्तारोत्सवस्य
 भेषो ङन्तव्यस्तस्मिन् दिने 8 यीशुः पितरं योऽनञ्चाडूय जगाद, युवां
 गत्वास्माकं भोजनार्थं निस्तारोत्सवस्य द्रव्याण्यासाद्यतं। 9 तदा तौ
 पप्रच्छतुः कुयासाद्ययो भवतः केच्छा? 10 तदा सोवादीतु, नगरे प्रविष्टे
 कश्चिज्जलकुम्भमादाय युवां साक्षात् करिष्यति स यन्निवेशनं प्रविशति
 युवामपि तन्निवेशनं तत्पश्चादित्वा निवेशनपतिम् एति वाक्यं वदतं, 11
 यत्राहं निस्तारोत्सवस्य भोज्यं शिष्यैः साद्धं भोक्तुं शक्नोमि सातिथिशाला
 कुत्र? कथामिमां प्रभुस्त्वां पृच्छति। 12 ततः स जनो द्वितीयप्रकोष्ठीयम्
 अेकं शस्तं कोष्ठं दर्शयिष्यति तत्र भोज्यमासाद्यतं। 13 ततस्तौ गत्वा
 तद्वाक्यानुसारेण सर्व्वं दृष्ट्वा तत्र निस्तारोत्सवीयं भोज्यमासाद्यामासतुः।
 14 अथ काल उपस्थिते यीशु द्वादशभिः प्रेरितैः सह भोक्तुमुपविश्य
 कथितवान् 15 मम दुःखभोगात् पूर्वं युत्वाभिः सह निस्तारोत्सवस्यैतस्य
 भोज्यं भोक्तुं मयातिवाञ्छा कृता। 16 युष्मान् वदामि, यावत्कालम्
 एश्वरराज्ये भोजनं न करिष्ये तावत्कालम् एदं न भोक्ष्ये। 17 तदा स
 पानपात्रमादाय एश्वरस्य गुणान् कीर्त्तयित्वा तेभ्यो दत्त्वावदत्, एदं गृह्णीत
 यूयं विभज्य पिवत। 18 युष्मान् वदामि यावत्कालम् एश्वरराजत्वस्य
 संस्थापनं न भवति तावद् द्राक्षाङ्गलरसं न पास्यामि। 19 ततः पूपं
 गृहीत्वा एश्वरगुणान् कीर्त्तयित्वा भङ्क्त्वा तेभ्यो दत्त्वावदत्, युष्मदर्थं
 समर्पितं यन्मम वपुस्तद्विदं, अेतत् कर्म मम स्मरणार्थं कुरुध्वं। 20 अथ
 भोजनान्ते तादृशं पात्रं गृहीत्वावदत्, युष्मत्कृते पातितं यन्मम रक्तं तेन
 निर्णीतनवनियमरूपं पानपात्रमिदं। 21 पश्यत यो मां परकरेषु समर्पयिष्यति
 स मया सह भोजनासन उपविशति। 22 यथा निरूपितमास्ते तदनुसारेण
 मनुष्यपुत्रस्य गति र्भविष्यति किन्तु यस्तं परकरेषु समर्पयिष्यति तस्य
 सन्तापो भविष्यति। 23 तदा तेषां को जन अेतत् कर्म करिष्यति तत्
 ते परस्परं प्रष्टुमारेभिरे। 24 अपरं तेषां को जनः श्रेष्ठत्वेन गणयिष्यते,
 अत्रार्थे तेषां विवादोभवत्। 25 अस्मात् कारणात् सोवदत्, अन्यदेशीयानां

રાજાનઃ પ્રજાનામુપરિ પ્રભુત્વં કુર્વન્તિ દારુણશાસનં કૃત્વાપિ તે ભૂપતિત્વેન
 વિખ્યાતા ભવન્તિ ચ | 26 કિન્તુ યુષ્માકં તથા ન ભવિષ્યતિ, યો યુષ્માકં શ્રેષ્ઠો
 ભવિષ્યતિ સ કનિષ્ઠવદ્ ભવતુ, યશ્ચ મુખ્યો ભવિષ્યતિ સ સેવકવદ્ભવતુ |
 27 ભોજનોપવિષ્ટપરિચારકયોઃ કઃ શ્રેષ્ઠઃ? યો ભોજનાયોપવિશતિ સ કિં શ્રેષ્ઠો
 ન ભવતિ? કિન્તુ યુષ્માકં મધ્યેડહં પરિચારકઈવાસ્મિ | 28 અપરઞ્ચ યુયં
 મમ પરીક્ષાકાલે પ્રથમમારભ્ય મયા સહ સ્થિતા 29 એતત્કારણાત્ પિત્રા
 યથા મદર્થં રાજ્યમેકં નિરૂપિતં તથાહમપિ યુષ્મદર્થં રાજ્યં નિરૂપયામિ | 30
 તસ્માન્ મમ રાજ્યે ભોજનાસને ચ ભોજનપાને કરિષ્યધ્વે સિંહાસનેષૂપવિશ્ય
 ચેસ્રાયેલીયાનાં દ્વાદશવંશાનાં વિચારં કરિષ્યધ્વે | 31 અપરં પ્રભુરુવાચ, હે
 શિમોન્ પશ્ય તિતઉના ધાન્યાનીવ યુષ્માન્ શૈતાન્ ચાલયિતુમ્ ઐચ્છત્,
 32 કિન્તુ તવ વિશ્વાસસ્ય લોપો યથા ન ભવતિ એતત્ ત્વદર્થં પ્રાર્થિતં
 મયા, ત્વન્મનસિ પરિવર્તિતે ચ ભ્રાતૃણાં મનાંસિ સ્થિરીકુરુ | 33 તદા
 સોવદત્, હે પ્રભોહં ત્વયા સાદ્ધં કારાં મૃતિઞ્ચ યાતું મજિજતોસ્મિ | 34 તતઃ
 સ ઉવાચ, હે પિતર ત્વાં વદામિ, અધ કુક્કુટરવાત્ પૂર્વ્વં ત્વં મત્પરિચયં
 વારત્રયમ્ અપહ્નોષ્યસે | 35 અપરં સ પપ્રચ્છ, યદા મુદ્રાસમ્પુટં ખાધપાત્રં
 પાદુકાઞ્ચ વિના યુષ્માન્ પ્રાહિણવં તદા યુષ્માકં કસ્યાપિ ન્યૂનતાસીત્? તે
 પ્રોયુઃ કસ્યાપિ ન | 36 તદા સોવદત્ કિન્વિવદાનીં મુદ્રાસમ્પુટં ખાધપાત્રં
 વા યસ્યાસ્તિ તેન તદ્ગ્રહીતવ્યં, યસ્ય ચ કૃપાણો નાસ્તિ તેન સ્વવસ્ત્રં
 વિક્રીય સ કેતવ્યઃ | 37 યતો યુષ્માનહં વદામિ, અપરાધિજનૈઃ સાદ્ધં ગણિતઃ
 સ ભવિષ્યતિ | ઇદં યચ્છાસ્ત્રીયં વચનં લિખિતમસ્તિ તન્મયિ ફલિષ્યતિ
 યતો મમ સમ્બન્ધીયં સર્વ્વં સેત્સ્યતિ | 38 તદા તે પ્રોયુઃ પ્રભો પશ્ય
 ઇમૌ કૃપાણૌ | તતઃ સોવદદ્ એતૌ યથેષ્ઠૌ | 39 અથ સ તસ્માદ્બહિર્ ગત્વા
 સ્વાચારાનુસારેણ જૈતુનનામાદ્રિં જગામ શિષ્યાશ્ચ તત્પશ્ચાદ્ યયુઃ | 40
 તત્રોપસ્થાય સ તાનુવાચ, યથા પરીક્ષાયાં ન પતથ તદર્થં પ્રાર્થયધ્વં | 41
 પશ્ચાત્ સ તસ્માદ્ એકશરક્ષેપાદ્ બહિર્ ગત્વા જાનુની પાતયિત્વા એતત્
 પ્રાર્થયાઞ્ચકે, 42 હે પિત ર્થદિ ભવાન્ સમ્મન્યતે તર્હિ કંસમેનં મમાન્તિકાદ્
 દૂરચ કિન્તુ મદિચ્છાનુરૂપં ન ત્વદિચ્છાનુરૂપં ભવતુ | 43 તદા તસ્મૈ શક્તિં
 દાતું સ્વર્ગીયદૂતો દર્શનં દદૌ | 44 પશ્ચાત્ સૌત્યન્તં યાતનયા વ્યાકુલો ભૂત્વા
 પુનર્દૃઢં પ્રાર્થયાઞ્ચકે, તસ્માદ્ બૃહચ્છોણિતબિન્દવ ઇવ તસ્ય સ્વેદબિન્દવઃ

પૃથિવ્યાં પતિતુમારેભિરે | 45 અથ પ્રાર્થનાત ઉત્થાય શિષ્યાણાં સમીપમેત્ય
 તાન્ મનોદુઃખિનો નિદ્રિતાન્ દૃષ્ટ્વાવદત્ 46 કુતો નિદ્રાથ? પરીક્ષાયામ્
 અપતનાર્થ પ્રર્થયધ્વં | 47 એતત્કથાયાઃ કથનકાલે દ્વાદશશિષ્યાણાં મધ્યે
 ગણિતો ચિહ્નનામા જનતાસહિતસ્તેષામ્ અગ્રે ચલિત્વા યીશોશ્રુમ્બનાર્થ
 તદન્તિકમ્ આયયૌ | 48 તદા યીશુરુવાચ, હે ચિહ્ન કિં યુમ્બનેન મનુષ્યપુત્રં
 પરકરેષુ સમર્પયસિ? 49 તદા ચધદ્ ઘટિષ્યતે તદનુમાય સક્ષિભિરુક્તં,
 હે પ્રભો વયં કિ ખજ્જેન ઘાતયિષ્યામઃ? 50 તત એકઃ કરવાલેનાહત્ય
 પ્રધાનયાજકસ્ય દાસસ્ય દક્ષિણં કર્ણં ચિચ્છેદ | 51 અધૂના નિવર્તસ્વ
 ઇત્યુક્ત્વા યીશુસ્તસ્ય શ્રુતિં સ્પૃષ્ટ્વા સ્વસ્યં ચકાર | 52 પશ્ચાદ્ યીશુઃ
 સમીપસ્થાન્ પ્રધાનયાજકાન્ મન્દિરસ્ય સેનાપતીન્ પ્રાચીનાંશ્ચ જગાદ, યૂયં
 કૃપાણાન્ યર્ષાશ્ચ ગૃહીત્વા માં કિં યોરં ધર્તુમાયાતાઃ? 53 યદાહં યુષ્માભિઃ
 સહ પ્રતિદિનં મન્દિરેડતિષ્ઠં તદા માં ધર્ત્તં ન પ્રવૃત્તાઃ, કિન્નિવદાનીં યુષ્માકં
 સમયોન્ધકારસ્ય ચાધિપત્યમસ્તિ | 54 અથ તે તં ધૃત્વા મહાયાજકસ્ય
 નિવેશનં નિન્યુઃ | તતઃ પિતરો દૂરે દૂરે પશ્ચાદિત્વા 55 બૃહત્કોષ્ઠસ્ય મધ્યે
 યત્રાગ્નિં જ્વાલયિત્વા લોકાઃ સમેત્યોપવિષ્ટાસ્તત્ર તૈઃ સાર્દ્ધમ્ ઉપવિવેશ | 56
 અથ વહ્નિસન્નિઘૌ સમુપવેશકાલે કાયિદ્વાસી મનો નિવિશ્ય તં નિરીક્ષ્યાવદત્
 પુમાનયં તસ્ય સજ્ઞેડસ્થાત્ | 57 કિન્તુ સ તદ્ અપહ્નુત્યાવાદીત્ હે નારિ
 તમહં ન પરિચિનોમિ | 58 ક્ષાણાન્તરેડન્યજનસ્તં દૃષ્ટ્વાબ્રવીત્ ત્વમપિ
 તેષાં નિકરસ્યૈકજનોસિ | પિતરઃ પ્રત્યુવાચ હે નર નાહમસ્મિ | 59 તતઃ
 સાર્દ્ધદાદ્વયાત્ પરં પુનરન્યો જનો નિશ્ચિત્ય બભાષે, એષ તસ્ય સજ્ઞીતિ
 સત્યં યતોયં ગાલીલીયો લોકઃ | 60 તદા પિતર ઉવાચ હે નર ત્વં યદ્ વદમિ
 તદહં બોદ્ધું ન શકનોમિ, ઇતિ વાક્યે કથિતમાત્રે કુક્કુટો રુરાવ | 61 તદા
 પ્રભુણા વ્યાધુટ્ય પિતરે નિરીક્ષિતે કૃકવાકુરવાત્ પૂર્વ્યં માં ત્રિરપહ્નોષ્યસે
 ઇતિ પૂર્વોક્તં તસ્ય વાક્યં પિતરઃ સ્મૃત્વા 62 બહિર્ગત્વા મહાખેદેન ચક્રન્દ |
 63 તદા યૈ ર્થીશુર્ધૃતસ્તે તમુપહસ્ય પ્રહર્તુમારેભિરે | 64 વસ્ત્રોણ તસ્ય દૃશૌ
 બદ્ધ્વા કપોલે ચપેટાઘાતં કૃત્વા પપ્રચ્છુઃ, કસ્તે કપોલે ચપેટાઘાતં કૃતવાન?
 ગણયિત્વા તદ્ વદ | 65 તદન્યત્ તદ્વિરુદ્ધં બહુનિન્દાવાક્યં વક્તુમારેભિરે |
 66 અથ પ્રભાતે સતિ લોકપ્રાચ્ચઃ પ્રધાનયાજકા અધ્યાપકાશ્ચ સભાં કૃત્વા
 મધ્યેસભં યીશુમાનીય પપ્રચ્છુઃ, ત્વમ્ અભિષિકતોસિ ન વાસ્માન્ વદ | 67 સ

प्रत्युवाय, मया तस्मिन्नुक्तेऽपि यूयं न विश्वसिष्यथ | 68 कस्मिंश्चिद्वाक्ये
युष्मान् पृष्टेऽपि मां न तद्दुतरं वक्ष्यथ न मां त्यक्ष्यथ य | 69 किन्वितः परं
मनुजसुतः सर्वशक्तिमत एश्वरस्य दक्षिणो पार्श्वे समुपवेक्ष्यति | 70
ततस्ते पप्रच्छुः, तिष्ठ त्वमीश्वरस्य पुत्रः? स कथयामास, यूयं यथार्थं वदथ
स अवाहं | 71 तदा ते सर्वे कथयामासुः, तिष्ठ साक्ष्येऽन्सस्मिन् अस्माकं
किं प्रयोजनं? अस्य स्वमुखादेव साक्ष्यं प्राप्तम् |

23 ततः सत्मास्थाः सर्वल्लोका उत्थाय तं पीलातसम्भुषं नीत्वाप्रोध
वक्तुमारोभिरे, 2 स्वमभिषिक्तं राजानं वदन्तं कैमरराजाय करदानं निषेधन्तं
राज्यविपर्ययं कुर्तुं प्रवर्तमानम् अनेन प्राप्ता वयं | 3 तदा पीलातस्तं
पृष्टवान् त्वं किं थिडूदीयानां राजा? स प्रत्युवाय त्वं सत्यमुक्तवान् | 4 तदा
पीलातः प्रधानयाजकादिलोकान् जगाद्, अहमेतस्य कमप्यपराधं नाप्तवान् |
5 ततस्ते पुनः साहसिनो भूत्वावदन्, ओष गालील अेतत्स्थानपर्यन्ते
सर्वस्मिन् थिडूदादेशे सर्वाल्लोकानुपदिश्य कुप्रवृत्तिं ग्राहीतवान् | 6
तदा पीलातो गालीलप्रदेशस्य नाम श्रुत्वा पप्रच्छ, किमयं गालीलीयो
लोकः? 7 ततः स गालीलप्रदेशीयडेरोट्राजस्य तदा स्थितेस्तस्य समीपे
थीशुं प्रेषयामास | 8 तदा डेरोट् थीशुं विलोक्य सन्तुतोष, यतः स तस्य
अडुवृत्तान्तश्रवाणात् तस्य किञ्चिदाश्चर्यकर्म पश्यति एत्याशां कृत्वा
अडुकालमारभ्य तं द्रष्टुं प्रयासं कृतवान् | 9 तस्मात् तं अडुकथाः पप्रच्छ
किन्तु स तस्य कस्यापि वाक्यस्य प्रत्युत्तरं नोवाय | 10 अथ प्रधानयाजका
अध्यापकाश्च प्रोत्तिष्ठन्तः साहसेन तमपवदितुं प्रारोभिरे | 11 डेरोट् तस्य
सेनागाणश्च तमवज्ञाय उपडासत्वेन राजवस्त्रं परिधाप्य पुनः पीलातं
प्रति तं प्राडिणोत् | 12 पूर्वं डेरोट्पीलातयोः परस्परं वैरभाव आसीत्
किन्तु तद्दिने द्वयोर् मेलनं जातम् | 13 पश्चात् पीलातः प्रधानयाजकान्
शासकान् लोकांश्च युगपदाडूय अभाषे, 14 राज्यविपर्ययकारकोयम्
एत्युक्त्वा मनुष्यमेनं मम निकटमानैश्च किन्तु पश्यत युष्माकं समक्षम् अस्य
वियारं कृत्वापि प्रोक्तापवादानुपेणस्य कोप्यपराधः सप्रमाणो न जातः,
15 यूयञ्च डेरोटः सन्निधौ प्रेषिता मया तत्रास्य कोप्यपराधस्तेनापि न
प्राप्तः | पश्यतानेन वधहेतुकं किमपि नापराद्धं | 16 तस्मादेनं ताडयित्वा
विलास्यामि | 17 तत्रोत्सवे तेषामेको मोचयितव्यः | 18 एति डेतोस्ते

પ્રોચ્ચૈરેકદા પ્રોચુઃ, એનં દૂરીકૃત્ય બરબ્બાનામાનં મોચય | 19 સ બરબ્બા
 નગર ઉપપ્લવવધાપરાધાભ્યાં કારાયાં બદ્ધ આસીત્ | 20 કિન્તુ પીલાતો
 યીશું મોચયિતું વાઞ્છન્ પુનસ્તાનુવાય | 21 તથાપ્યેનં કુશે વ્યધ કુશે
 વ્યધેતિ વદન્તસ્તે રુરુવુઃ | 22 તતઃ સ તૃતીયવારં જગાદ કુતઃ? સ કિં કર્મ
 કૃતવાન? નાહમસ્ય કમપિ વધાપરાધં પ્રાપ્તઃ કેવલં તાડયિત્વામું ત્યજામિ |
 23 તથાપિ તે પુનરેનં કુશે વ્યધ ઇત્યુકત્વા પ્રોચ્ચૈર્દૃઢં પ્રાર્થયાઞ્ચક્રિરે; 24
 તતઃ પ્રધાનયાજકાદીનાં કલરવે પ્રબલે સતિ તેષાં પ્રાર્થનારૂપં કર્તું પીલાત
 આદિદેશ | 25 રાજદ્રોહવધયોરપરાધેન કારાસ્થં યં જનં તે યયાચિરે તં
 મોચયિત્વા યીશું તેષામિચ્છાયાં સમાર્પયત્ | 26 અથ તે યીશું ગૃહીત્વા
 યાન્તિ, એતર્હિ ગ્રામાદાગતં શિમોનનામાનં કુરીણીયં જનં ધૃત્વા યીશોઃ
 પશ્રાન્નેતું તસ્ય સ્કન્ધે કુશમર્પયામાસુઃ | 27 તતો લોકારણ્યમધ્યે બહુસ્ત્રિયો
 રુદત્યો વિલપન્ત્યશ્ચ યીશોઃ પશ્રાદ્ યયુઃ | 28 કિન્તુ સ વ્યાઘુટ્ય તા
 ઉવાચ, હે ચિરૂશાલમો નાર્યો યુયં મદર્થં ન રુદિત્વા સ્વાર્થં સ્વાપત્યાર્થઞ્ચ
 રુદિતિ; 29 પશ્યત યઃ કદાપિ ગર્ભવત્યો નાભવન્ સ્તન્યઞ્ચ નાપાયયન્
 તાદૃશી વન્ધ્યા યદા ધન્યા વક્ષ્યન્તિ સ કાલ આયાતિ | 30 તદા હે શૈલા
 અસ્માકમુપરિ પતત, હે ઉપશૈલા અસ્માનાચ્છાદયત કથામીદૃશીં લોકા
 વક્ષ્યન્તિ | 31 યતઃ સતેજસિ શાખિનિ ચેદેતદ્ ઘટતે તર્હિ શુષ્કશાખિનિ
 કિં ન ઘટિષ્યતે? 32 તદા તે હન્તું દ્વાવપરાધિનૌ તેન સાદ્ધં નિન્યુઃ | 33
 અપરં શિરઃકપાલનામકસ્થાનં પ્રાપ્ય તં કુશે વિવિધુઃ; તદ્વયોરપરાધિનોરેકં
 તસ્ય દક્ષિણો તદન્યં વામે કુશે વિવિધુઃ | 34 તદા યીશુરકથયત્, હે
 પિતરેતાન્ ક્ષમસ્વ યત એતે યત્ કર્મ કુર્વન્તિ તન્ ન વિદુઃ; પશ્રાત્તે
 ગુટિકાપાતં કૃત્વા તસ્ય વસ્ત્રાણિ વિભજ્ય જગહુઃ | 35 તત્ર લોકસંઘસ્તિષ્ઠન્
 દદર્શ; તે તેષાં શાસકાશ્ચ તમુપહસ્ય જગહુઃ, એષ ઇતરાન્ રક્ષિતવાન્
 યદીશ્વરેણાભિરુચિતો ડભિષિક્તસ્ત્રાતા ભવતિ તર્હિ સ્વમધુના રક્ષતુ |
 36 તદન્યઃ સેનાગણા એત્ય તસ્મૈ અમ્બરસં દત્વા પરિહસ્ય પ્રોવાચ,
 37 ચેત્વં ચિહ્નૂદીયાનાં રાજાસિ તર્હિ સ્વં રક્ષા | 38 ચિહ્નૂદીયાનાં રાજેતિ
 વાક્યં યૂનાનીયરોમીયેબ્રીયાક્ષરૈ લિખિતં તચ્છિરસ ઊર્દ્ધ્વેડસ્થાપ્યત | 39
 તદોભયપાર્શ્વયો વિદ્વૌ યાવપરાધિનૌ તયોરેકસ્તં વિનિન્ધ બભાષે, ચેત્વમ્
 અભિષિક્તોસિ તર્હિ સ્વમાવાઞ્ચ રક્ષા | 40 કિન્ત્વન્યસ્તં તર્જયિત્વાવદત્,

ઈશ્વરાત્ત્વ કિંચિદપિ ભયં નાસ્તિ કિં? ત્વમપિ સમાનદણ્ડોસિ, 41
 યોગ્યપાત્રે આવાં સ્વસ્વકર્મણાં સમુચિતફલં પ્રાપ્નુવઃ કિન્ત્વનેન કિમપિ
 નાપરાદ્ધં | 42 અથ સ યીશું જગાદ હે પ્રભે ભવાન્ સ્વરાજ્યપ્રવેશકાલે
 માં સ્મરતુ | 43 તદા યીશુઃ કથિતવાન્ ત્વાં યથાર્થં વદામિ ત્વમધૈવ મયા
 સાદ્ધં પરલોકસ્ય સુખસ્થાનં પ્રાપ્સ્યસિ | 44 અપરઞ્ચ દ્વિતીયયામાત્
 તૃતીયયામપર્યન્તં રવેસ્તેજસોન્તર્હિતત્વાત્ સર્વદેશોઽન્ધકારેણાવૃતો 45
 મન્દિરસ્ય યવનિકા ય છિધમાના દ્વિધા બભૂવ | 46 તતો યીશુરુચ્યૈરુવાચ,
 હે પિત મમાત્માનં તવ કરે સમર્પયે, ઇત્યુક્ત્વા સ પ્રાણાન્ જહૌ | 47 તદૈતા
 ઘટના દૃષ્ટ્વા શતસેનાપતિરીશ્વરં ધન્યમુક્ત્વા કથિતવાન્ અયં નિતાન્તં
 સાધુમનુષ્ય આસીત્ | 48 અથ યાવન્તો લોકા દ્રઙ્મ્ આગતાસ્તે તા ઘટના
 દૃષ્ટ્વા વક્ષઃસુ કરાઘાતં કૃત્વા વ્યાયુટ્ય ગતાઃ | 49 યીશો જ્ઞાતયો યા યા
 યોષિતશ્ચ ગાલીલસ્તેન સાદ્ધમાયાતાસ્તા અપિ દૂરે સ્થિત્વા તત્ સર્વં
 દદૃશુઃ | 50 તદા ચિહ્નદીયાનાં મન્ત્રણાં ક્રિયાઞ્ચાસમ્મન્યમાન ઈશ્વરસ્ય
 રાજત્વમ્ અપેક્ષમાણો 51 ચિહ્નદિદેશીયો ડરિમથીયનગરીયો યૂષ્ફનામા
 મન્ત્રી ભદ્રો ધાર્મિકશ્ચ પુમાન્ 52 પીલાતાન્તિકં ગત્વા યીશો દેહં યયાચે |
 53 પશ્ચાદ્ વપુરવરોહ્ય વાસસા સંવેષ્ટ્ય યત્ર કોપિ માનુષો નાસ્થાપ્યત
 તસ્મિન્ શૈલે સ્વાતે શ્મશાને તદસ્થાપયત્ | 54 તદ્દિનમાયોજનીયં દિનં
 વિશ્રામવારશ્ચ સમીપઃ | 55 અપરં યીશુના સાદ્ધં ગાલીલ આગતા યોષિતઃ
 પશ્ચાદ્દિત્વા શ્મશાને તત્ર યથા વપુઃ સ્થાપિતં તચ્ચ દૃષ્ટ્વા 56 વ્યાઘુટ્ય
 સુગન્ધિદ્રવ્યતૈલાનિ કૃત્વા વિધિવદ્ વિશ્રામવારે વિશ્રામં ચક્રુઃ |

24 અથ સપ્તાહપ્રથમદિનેડતિપ્રત્યૂષે તા યોષિતઃ સમ્પાદિતં સુગન્ધિદ્રવ્યં
 ગૃહીત્વા તદન્યાભિઃ ક્રિયતીભિઃ સ્ત્રીભિઃ સહ શ્મશાનં યયુઃ | 2 કિન્તુ
 શ્મશાનદ્વારાત્ પાષાણમપસારિતં દૃષ્ટ્વા 3 તાઃ પ્રવિશ્ય પ્રભો દેહમપ્રાપ્ય
 4 વ્યાકુલા ભવન્તિ એતર્હિ તેજોમયવસ્ત્રાન્વિતૌ દ્વૌ પુરુષૌ તાસાં સમીપે
 સમુપસ્થિતૌ 5 તસ્માત્તાઃ શઙ્ગાયુક્તા ભૂમાવધોમુખ્યસ્યસ્થુઃ | તદા તૌ તા
 ઊચતુ મૃતાનાં મધ્યે જીવન્તં કુતો મૃગયથ? 6 સોત્ર નાસ્તિ સ ઉદસ્થાત્ |
 7 પાપિનાં કરેષુ સમર્પિતેન કુશે હતેન ચ મનુષ્યાપુત્રેણ તૃતીયદિવસે
 શ્મશાનાદુત્થાતવ્યમ્ ઇતિ કથાં સ ગલીલિ તિષ્ઠન્ યુષ્મભ્યં કથિતવાન્
 તાં સ્મરત | 8 તદા તસ્ય સા કથા તાસાં મનઃસુ જાતા | 9 અનન્તરં

શ્મશાનાદ્ ગત્વા તા એકાદશશિષ્યાદિભ્યઃ સર્વેભ્યસ્તાં વાર્તા કથયામાસુઃ |
 10 મગ્દલીનીમરિયમ્, યોહના, યાકૂબો માતા મરિયમ્ તદન્યાઃ સક્લિન્યો
 યોષિતશ્ચ પ્રેરિતેભ્ય એતાઃ સર્વા વાર્તાઃ કથયામાસુઃ 11 કિન્તુ તાસાં
 કથામ્ અનર્થકાખ્યાનમાત્રં બુદ્ધ્વા કોપિ ન પ્રત્યૈત્ | 12 તદા પિતર ઉત્થાય
 શ્મશાનાન્તિકં દધાવ, તત્ર ય પ્રહ્લો ભૂત્વા પાર્શ્વેકસ્થાપિતં કેવલં વસ્ત્રં
 દદર્શ; તસ્માદાશ્ચર્યં મન્યમાનો યદઘટત તન્મનસિ વિચારયન્ પ્રતસ્થે |
 13 તસ્મિન્નેવ દિને દ્વૌ શિષ્યૌ ચિરૂશાલમશ્ચતુષ્કોશાન્તરિતમ્ ઇમ્માયુગ્રામં
 ગચ્છન્તૌ 14 તાસાં ઘટનાનાં કથામકથયતાં 15 તયોરાલાપવિચારયોઃ કાલે
 યીશુરાગત્ય તાભ્યાં સહ જગામ 16 કિન્તુ યથા તૌ તં ન પરિચિનુતસ્તદર્થં
 તયો દૃષ્ટિઃ સંરુદ્ધા | 17 સ તૌ પૃષ્ટવાન્ યુવાં વિષાણૌ કિં વિચારયન્તૌ
 ગચ્છથઃ? 18 તતસ્તયોઃ ક્લિયપાનામા પ્રત્યુવાય ચિરૂશાલમપુરેડધુના
 યાન્યઘટન્ત ત્વં કેવલવિદેશી કિં તદ્દુત્તાન્તં ન જાનાસિ? 19 સ પપ્રચ્છ કા
 ઘટનાઃ? તદા તૌ વક્તુમારેભાતે યીશુનામા યો નાસરતીયો ભવિષ્યદ્વાદી
 ઇશ્વરસ્ય માનુષાણાઞ્ચ સાક્ષાત્ વાક્યે કર્મણિ ચ શક્તિમાનાસીત્ 20
 તમ્ અસ્માકં પ્રધાનયાજકા વિચારકાશ્ચ કેનાપિ પ્રકારેણ કુશે વિદ્ધ્વા
 તસ્ય પ્રાણાનનાશયન્ તદીયા ઘટનાઃ; 21 કિન્તુ ય ઇસ્રાયેલીયલોકાન્
 ઉદ્ધારયિષ્યતિ સ એવાયમ્ ઇત્યાશાસ્માભિઃ કૃતા | તદથા તથાસ્તુ તસ્યા
 ઘટનાયા અધ દિનત્રયં ગતં | 22 અધિકન્ત્વસ્માકં સક્લિનીનાં કિચત્સ્ત્રીણાં
 મુખેભ્યોડસમ્ભવવાક્યમિદં શ્રુતં; 23 તાઃ પ્રત્યૂષે શ્મશાનં ગત્વા તત્ર તસ્ય
 દેહમ્ અપ્રાપ્ય વ્યાઘુટ્યેત્વા પ્રોક્તવત્યઃ સ્વર્ગોસદ્ભૂતૌ દૃષ્ટાવસ્માભિસ્તૌ
 યાવાદિષ્ટાં સ જીવિતવાન્ | 24 તતોસ્માકં કૈશ્ચિત્ શ્મશાનમગમ્યત તેડપિ
 સ્ત્રીણાં વાક્યાનુરૂપં દૃષ્ટવન્તઃ કિન્તુ તં નાપશ્યન્ | 25 તદા સ તાવુવાય,
 હે અબોધૌ હે ભવિષ્યદ્વાદિભિરુક્તવાક્યં પ્રત્યેતું વિલમ્બમાનો; 26
 એતત્સર્વદુઃખં ભુક્ત્વા સ્વભૂતિપ્રાપ્તિઃ કિં ખીષ્ટસ્ય ન ન્યાથ્યા? 27
 તતઃ સ મૂસાગ્રન્થમારભ્ય સર્વભવિષ્યદ્વાદિનાં સર્વશાસ્ત્રે સ્વસ્મિન્
 લિખિતાખ્યાનાભિપ્રાયં બોધયામાસ | 28 અથ ગમ્યગ્રામાભ્યર્ણ પ્રાપ્ય
 તેનાગ્રે ગમનલક્ષણે દર્શિતે 29 તૌ સાધયિત્વાવદતાં સહાવાભ્યાં તિષ્ઠ
 દિને ગતે સતિ રત્નિરભૂત્; તતઃ સ તાભ્યાં સાદ્ધ્ સ્થાતું ગૃહં યચૌ | 30
 પશ્ચાદ્ભોજનોપવેશકાલે સ પૂર્ણં ગૃહીત્વા ઇશ્વરગુણાન્ જગાદ તન્ન ભંક્ત્વા

ताभ्यां ददौ | 31 तदा तयो दृष्टौ प्रसन्नायां तं प्रत्यभिज्ञातुः किन्तु स तयोः
 साक्षादन्तर्दधे | 32 ततस्तौ मिथोभिधातुम् आरब्धवन्तौ गमनकाले यदा
 कथामकथयत् शास्त्रार्थबोधयत् तदावयो बुद्धिः किं न प्राञ्जलत्? 33
 तौ तत्क्षणाद्दुत्थाय यिज्ञशालमपुरं प्रत्याययतुः, तत्स्थाने शिष्याणाम्
 अेकादशानां सङ्गिनाञ्च दर्शनं जातं | 34 ते प्रोयुः प्रभुरुदतिष्ठद् एति
 सत्यं शिमोने दर्शनमदाय्य | 35 ततः पथः सर्व्वघटनायाः पूपभञ्जनेन
 तत्परिययस्य य सर्व्ववृत्तान्तं तौ वक्तुमारेत्माते | 36 एत्थं ते परस्परं
 वदन्ति तत्काले यीशुः स्वयं तेषां मध्य प्रोत्थय युष्माकं कल्याणं भूयाद्
 एत्युवाय, 37 किन्तु भूतं पश्याम एत्यनुमाय ते समुद्विचिरे त्रेषुश्च |
 38 स उवाय, कुतो दुःखिता भवथ? युष्माकं मनःसु सन्देह उदेति य
 कुतः? 39 अेषोऽहं, मम करौ पश्यत वरं स्पृष्ट्वा पश्यत, मम यादृशानि
 पश्यथ तादृशानि भूतस्य मांसास्थीनि न सन्ति | 40 एत्युक्त्वा स
 उस्तपादान् दर्शयामास | 41 तेऽसम्भवं ज्ञात्वा सानन्दा न प्रत्ययन् |
 ततः स तान् पप्रच्छ, अत्र युष्माकं समीपे षाधं किञ्चिदस्ति? 42
 ततस्ते कियद्गधमत्स्यं मधु य द्दुः 43 स तदादाय तेषां साक्षाद् बुभुजे
 44 कथयामास य भूसाव्यवस्थायां भविष्यद्वादिनां ग्रन्थेषु गीतपुस्तके
 य मयि यानि सर्व्वानि वयनानि लिखितानि तदनुज्ञपाणि घटिष्यन्ते
 युष्माभिः साद्धं स्थित्वाहं यदेतद्वाक्यम् अवदं तदिदानीं प्रत्यक्षमभूत् |
 45 अथ तेभ्यः शास्त्रबोधाधिकारं दत्त्वावदत्, 46 श्रीष्टेनेत्थं मृत्तियातना
 भोक्तव्या तृतीयदिने य श्मशानाद्दुत्थातव्यञ्चेति लिपिरस्ति; 47 तन्नाम्ना
 यिज्ञशालममारभ्य सर्व्वदेशे मनःपरावर्तनस्य पापमोचनस्य य सुसंवादेः
 प्रचारयितव्यः, 48 अेषु सर्व्वेषु यूयं साक्षिणः | 49 अपरञ्च पश्यत
 पित्रा यत् प्रतिज्ञातं तत् प्रेषयिष्यामि, अतमेव यावत्कालं यूयं स्वर्गायां
 शक्तिं न प्राप्स्यथ तावत्कालं यिज्ञशालमगरे तिष्ठत | 50 अथ स तान्
 वैथनीयापर्य्यन्तं नीत्वा उस्तावुत्तोल्य आशिष वक्तुमारेत्मे 51 आशिषं
 वदन्नेव य तेभ्यः पृथग् भूत्वा स्वर्गाय नीतोऽभवत् | 52 तदा ते तं
 भजमाना मडानन्देन यिज्ञशालमं प्रत्याजग्मुः | 53 ततो निरन्तरं मन्दिरे
 तिष्ठन्त एश्वरस्य प्रशंसां धन्यवादेञ्च कर्त्तम् आरेभिरे | एति | |

યોહન:

1 આદૌ વાદ આસીત્ સ ય વાદ ઈશ્વરેણ સાર્ધમાસીત્ સ વાદ: સ્વયમીશ્વર એવ | 2 સ આદાવીશ્વરેણ સહાસીત્ | 3 તેન સર્વ્વ વસ્તુ સસૃજે સર્વ્વેષુ સૃષ્ટવસ્તુષુ કિમપિ વસ્તુ તેનાસૃષ્ટં નાસ્તિ | 4 સ જીવનસ્યાકાર: , તસ્ય જીવનં મનુષ્યાણાં જ્યોતિ: 5 તજ્જ્યોતિરન્ધકારે પ્રચકાશે કિન્ત્વન્ધકારસ્તન્ જગ્રાહ | 6 યોહન્ નામક એકો મનુજ ઈશ્વરેણ પ્રેષયાઞ્ચક્રે | 7 તદ્વારા યથા સર્વ્વે વિશ્વસન્તિ તદર્થં સ તજ્જ્યોતિષિ પ્રમાણં દાતું સાક્ષિસ્વરૂપો ભૂત્વાગમત્, 8 સ સ્વયં તજ્જ્યોતિ ન કિન્તુ તજ્જ્યોતિષિ પ્રમાણં દાતુમાગમત્ | 9 જગત્યાગત્ય ય: સર્વ્વમનુજેભ્યો દીપ્તિં દદાતિ તદેવ સત્યજ્યોતિ: | 10 સ યજ્જગદસૃજત્ તન્મધ એવ સ આસીત્ કિન્તુ જગતો લોકાસ્તં નાજાનન્ | 11 નિજાધિકારં સ આગચ્છત્ કિન્તુ પ્રજાસ્તં નાગૃહ્ણન્ | 12 તથાપિ યે યે તમગૃહ્ણન્ અર્થાત્ તસ્ય નામ્નિ વ્યશ્વસન્ તેભ્ય ઈશ્વરસ્ય પુત્રા ભવિતુમ્ અધિકારમ્ અદદાત્ | 13 તેષાં જનિ: શોણિતાન્ શારીરિકાભિલાષાન્ માનવાનામિચ્છાતો ન કિન્ત્વીશ્વરાદભવત્ | 14 સ વાદો મનુષ્યરૂપેણાવતીર્ય સત્યતાનુગ્રહાભ્યાં પરિપૂર્ણ: સન્ સાર્ધમ્ અસ્માભિ ન્યવસત્ તત: પિતુરદ્વિતીયપુત્રસ્ય યોગ્યો યો મહિમા તં મહિમાનં તસ્યાપશ્યામ | 15 તતો યોહનપિ પ્રચાર્ય સાક્ષ્યમિદં દત્તવાન્ યો મમ પશ્ર્ચાદ્ આગમિષ્યતિ સ મત્તો ગુરુતર:; યતો મત્પૂર્વ્વં સ વિધમાન આસીત્; યદર્થમ્ અહં સાક્ષ્યમિદમ્ અદાં સ એષ: | 16 અપરઞ્ચ તસ્ય પૂર્ણતાયા વયં સર્વ્વે ક્રમશ: ક્રમશોનુગ્રહં પ્રાપ્તા: | 17 મૂસાદ્વારા વ્યવસ્થા દત્તા કિન્ત્વનુગ્રહ: સત્યત્વઞ્ચ યીશુખ્રીષ્ટદ્વારા સમુપાતિષ્ઠતાં | 18 કોપિ મનુજ ઈશ્વરં કદાપિ નાપશ્યત્ કિન્તુ પિતુ: કોડસ્થોડદ્વિતીય: પુત્રસ્તં પ્રકાશયત્ | 19 ત્વં ક: ? ઇતિ વાક્યં પ્રેષ્ટું યદા યિહૂદીયલોકા યાજકાન્ લેવિલોકાંશ્ચ યિરૂશાલમો યોહન: સમીપે પ્રેષયામાસુ: , 20 તદા સ સ્વીકૃતવાન્ નાપહ્ણતવાન્ નાહમ્ અભિષિક્ત ઇત્યક્ષીકૃતવાન્ | 21 તદા તેડપૃચ્છન્ તર્હિ કો ભવાન્ ? કિં એલિય: ? સોવદત્ ન; તતસ્તેડપૃચ્છન્ તર્હિ ભવાન્ સ ભવિષ્યદ્વાદી ? સોવદત્ નાહં સ: | 22 તદા તેડપૃચ્છન્ તર્હિ ભવાન્ ક: ? વયં ગત્વા પ્રેરકાન્ ત્વયિ કિં વક્ષ્યામ: ? સ્વસ્મિન્ કિં વદસિ ? 23 તદા સોવદત્ | પરમેશસ્ય પન્થાનં પરિષ્કુરુત સર્વ્વત: | ઇતીદં પ્રાન્તરે વાક્યં વદત: કસ્યચિદ્રવ: | કથામિમાં યસ્મિન્ યિશાયિયો ભવિષ્યદ્વાદી

લિખિતવાન્ સોહમ્ | 24 યે પ્રેષિતાસ્તે ફિરૂશિલોકાઃ | 25 તદા તેડપૃચ્છન્
 યદિ નાભિષિક્તોસિ એલિયોસિ ન સ ભવિષ્યદ્વાધપિ નાસિ ચ, તર્હિ લોકાન્
 મજ્જયસિ કુતઃ? 26 તતો યોહન્ પ્રત્યવોચત્, તોયેડહં મજ્જયામીતિ સત્યં
 કિન્તુ ચં ચૂયં ન જાનીથ તાદૃશ એકો જનો યુષ્માકં મધ્ય ઉપતિષ્ઠતિ | 27
 સ મત્પશ્ચાદ્ આગતોપિ મત્પૂર્વ્વં વર્તમાન આસીત્ તસ્ય પાદુકાબન્ધનં
 મોચયિતુમપિ નાહં યોગ્યોસ્મિ | 28 યદ્દનનધાઃ પારસ્થબૈથબારાયાં
 યસ્મિન્સ્થાને યોહનમજ્જયત્ તસ્મિન્ સ્થાને સર્વમેતદ્ અઘટત | 29
 પરેડહનિ યોહન્ સ્વનિકટમાગચ્છન્તં યિશું વિલોક્ય પ્રાવોચત્ જગતઃ
 પાપમોચકમ્ ઈશ્વરસ્ય મેષશાવકં પશ્યત | 30 યો મમ પશ્ચાદાગમિષ્યતિ સ
 મત્તો ગુરુતરઃ, યતો હેતોર્મત્પૂર્વ્વં સોડવર્તત યસ્મિન્નાહં કથામિમાં કથિતવાન્
 સ એવાયં | 31 અપરં નાહમેનં પ્રત્યભિજ્ઞાતવાન્ કિન્તુ ઇસ્રાયેલ્લોકા
 એનં યથા પરિચિન્વન્તિ તદભિપ્રાયેણાહં જલે મજ્જયિતુમાગચ્છમ્ |
 32 પુનશ્ચ યોહનપરમેકં પ્રમાણં દત્વા કથિતવાન્ વિહાયસઃ કપોતવદ્
 અવતરન્તમાત્માનમ્ અસ્યોપર્યવતિષ્ઠન્તં ચ દૃષ્ટવાનહમ્ | 33 નાહમેનં
 પ્રત્યભિજ્ઞાતવાન્ ઇતિ સત્યં કિન્તુ યો જલે મજ્જયિતું માં પ્રૈરયત્ સ એવેમાં
 કથામકથયત્ યસ્યોપર્યવત્માનમ્ અવતરન્તમ્ અવતિષ્ઠન્તઞ્ચ દ્રક્ષયસિ
 સએવ પવિત્રે આત્મનિ મજ્જયિષ્યતિ | 34 અવસ્તન્નિરીક્ષ્યાયમ્ ઈશ્વરસ્ય
 તનય ઇતિ પ્રમાણં દદામિ | 35 પરેડહનિ યોહન્ દ્વાભ્યાં શિષ્યાભ્યાં સાદ્ધ્વં
 તિષ્ઠન્ 36 યિશું ગચ્છન્તં વિલોક્ય ગદ્ધિતવાન્ ઈશ્વરસ્ય મેષશાવકં પશ્યતં |
 37 ઇમાં કથાં શ્રુત્વા દ્વૌ શિષ્યૌ યીશોઃ પશ્ચાદ્ ઇયતુઃ | 38 તતો યીશુઃ
 પરાવૃત્ય તૌ પશ્ચાદ્ આગચ્છન્તૌ દૃષ્ટ્વા પૃષ્ટવાન્ યુવાં કિં ગવેશયથઃ?
 તાવપૃષ્ટતાં હે રબ્બિ અર્થાત્ હે ગુરો ભવાન્ કુત્ર તિષ્ઠતિ? 39 તતઃ સોવાદિત્
 એત્ય પશ્યતં | તતો દિવસસ્ય તૃતીયપ્રહરસ્ય ગતત્વાત્ તૌ તદ્દિનં તસ્ય
 સજ્ઞેડસ્થાતાં | 40 યૌ દ્વૌ યોહનો વાક્યં શ્રુત્વા યિશોઃ પશ્ચાદ્ આગમતાં
 તયોઃ શિમોન્પિતરસ્ય ભ્રાતા આન્દ્રિયઃ 41 સ ઇત્વા પ્રથમં નિજસોદરં
 શિમોનં સાક્ષાત્પ્રાપ્ય કથિતવાન્ વયં ખ્રીષ્ટમ્ અર્થાત્ અભિષિક્તપુરુષં
 સાક્ષાત્કૃતવન્તઃ | 42 પશ્ચાત્ સ તં યિશોઃ સમીપમ્ આનયત્ | તદા યીશુસ્તં
 દૃષ્ટ્વાવદત્ ત્વં યૂનસઃ પુત્રઃ શિમોન્ કિન્તુ ત્વન્નામધેયં કૈફાઃ વા પિતરઃ અર્થાત્
 પ્રસ્તરો ભવિષ્યતિ | 43 પરેડહનિ યીશૌ ગાલીલં ગન્તું નિશ્ચિતયેતસિ

સતિ ક્ષિલિપનામાનં જનં સાક્ષાત્રાપ્યાવોચત્ મમ પશ્ચાદ્ આગચ્છ | 44
 બૈત્સૈદાનામ્નિ યસ્મિન્ ગ્રામે પિતરાન્દ્રિયયોર્વાસ આસીત્ તસ્મિન્ ગ્રામે તસ્ય
 ક્ષિલિપસ્ય વસતિરાસીત્ | 45 પશ્ચાત્ ક્ષિલિપો નિથનેલં સાક્ષાત્રાપ્યાવદત્
 મૂસા વ્યવસ્થા ગ્રન્થે ભવિષ્યદ્વાદિનાં ગ્રન્થેષુ ચ યસ્યાપ્યાનં લિખિતમાસ્તે
 તં યૂષ્કઃ પુત્રં નાસરતીયં યીશું સાક્ષાદ્ અકાર્ષ્મ વયં | 46 તદા નિથનેલ્
 કથિતવાન્ નાસરન્નગરાત કિં કશ્ચિદ્દુત્તમ ઉત્પન્તું શકનોતિ? તતઃ ક્ષિલિપો
 ડવોચત્ એત્ય પશ્ય | 47 અપરઞ્ચ યીશુઃ સ્વસ્ય સમીપં તમ્ આગચ્છન્તં
 દૃષ્ટ્વા વ્યાહતવાન્ પશ્યાયં નિષ્કપટઃ સત્ય ઇસ્રાયેલ્લોકઃ | 48 તતઃ સોવદદ્
 ભવાન્ માં કથં પ્રત્યભિજાનાતિ? યીશુરવાદીત્ ક્ષિલિપસ્ય આહ્વાનાત્ પૂર્વ્યં
 યદા ત્વમુદુમ્બરસ્ય તરોર્મૂલેડસ્થાસ્તદા ત્વામદર્શમ્ | 49 નિથનેલ્ અચકથત્
 હે ગુરો ભવાન્ નિતાન્તમ્ ઇશ્વરસ્ય પુત્રોસિ, ભવાન્ ઇસ્રાયેલ્વંશસ્ય
 રાજા | 50 તતો યીશુ વ્યાહરત્, ત્વામુદુમ્બરસ્ય પાદપસ્ય મૂલે દૃષ્ટવાનાહં
 મમૈતસ્માદ્વાક્યાત્ કિં ત્વં વ્યશ્વસીઃ? એતસ્માદપ્યાશ્ચર્યાણિ કાર્યાણિ
 દ્રક્ષ્યસિ | 51 અન્યચ્યાવાદીદ્ યુષ્માનહં યથાર્થં વદામિ, ઇતઃ પરં મોચિતે
 મેઘદ્વારે તસ્માન્મનુજસૂનુના ઇશ્વરસ્ય દૂતગણમ્ અવરોહન્તમારોહન્તઞ્ચ
 દ્રક્ષ્યથ |

2 અનન્તરં ત્રુતીયદિવસે ગાલીલ્ પ્રદેશિયે કાન્નાનામ્નિ નગરે વિવાહ
 આસીત્ તત્ર ચ યીશોર્માતા તિષ્ઠત્ | 2 તસ્મૈ વિવાહાય યીશુસ્તસ્ય
 શિષ્યાશ્ચ નિમન્ત્રિતા આસન્ | 3 તદનન્તરં દ્રાક્ષારસસ્ય ન્યૂનત્વાદ્
 યીશોર્માતા તમવદત્ એતેષાં દ્રાક્ષારસો નાસ્તિ | 4 તદા સ તામવોચત્
 હે નારિ મયા સહ તવ કિં કાર્ય્યં? મમ સમય ઇદાનીં નોપતિષ્ઠતિ |
 5 તતસ્તસ્ય માતા દાસાનવોચદ્ અયં યદ્ વદતિ તદેવ કુરુત | 6
 તસ્મિન્ સ્થાને યિહૂદીયાનાં શુચિત્વકરણવ્યવહારાનુસારેણાઢકૈકજલધરાણિ
 પાષાણમયાનિ ષડ્વૃહત્પાત્રાણિઆસન્ | 7 તદા યીશુસ્તાન્ સર્વ્વકલશાન્
 જલૈઃ પૂરયિતું તાનાજ્ઞાપયત્, તતસ્તે સર્વ્વાન્ કુમ્ભાનાકર્ણાં જલૈઃ
 પર્યપૂરયન્ | 8 અથ તેભ્યઃ કિઞ્ચિદ્દુત્તાર્ય્ય ભોજ્યાધિપાતેઃસમીપં નેતું
 સ તાનાદિશત્, તે તદનયન્ | 9 અપરઞ્ચ તજ્જલં કથં દ્રાક્ષારસોડભવત્
 તજ્જલવાહકાદાસા જ્ઞાતું શક્તાઃ કિન્તુ તદ્ભોજ્યાધિપો જ્ઞાતું નાશકનોત્
 તદવલિહ્વા વરં સંમ્બોધાવદત્, 10 લોકાઃ પ્રથમં ઉત્તમદ્રાક્ષારસં દદતિ તપુ

યથેષ્ટં પિતવત્સુ તસ્મા કિંચિદનુત્તમઞ્ચ દદતિ કિન્તુ ત્વમિદાનીં યાવત્
 ઉત્તમદ્રાક્ષારસં સ્થાપયસિ | 11 ઇત્યં યીશુર્ગાલીલપ્રદેશે આશ્ચર્યકાર્મ
 પ્રારમ્ભ નિજમહિમાનં પ્રાકાશયત્ તતઃ શિષ્યાસ્તસ્મિન્ વ્યશ્વસન્ | 12
 તતઃ પરમ્ સ નિજમાત્રુભ્રાત્રુસ્શિષ્યૈઃ સાર્દ્ધં કફર્નાહૂમમ્ આગમત્ કિન્તુ
 તત્ર બહૂદિનાનિ આતિષ્ઠત્ | 13 તદનન્તરં ચિહ્નદિયાનાં નિસ્તારોત્સવે
 નિકટમાગતે યીશુ ચિહ્નશાલમ્ નગરમ્ આગચ્છત્ | 14 તતો મન્દિરસ્ય મધ્યે
 ગોમેષપારાવતવિક્રયિણો વાણિજક્યોપવિષ્ણાન્ વિલોક્ય 15 રજજુભિઃ
 કશાં નિર્માય સર્વગોમેષાદિભિઃ સાર્દ્ધં તાન્ મન્દિરાદ્ દૂરીકૃતવાન્ | 16
 વણિજાં મુદ્રાદિ વિકીર્ય આસનાનિ ન્યૂજ્જકૃત્ય પારાવતવિક્રયિભ્યોડકથયદ્
 અસ્માત્ સ્થાનાત્ સર્વાણ્યેતાનિ નયત, મમ પિતુગૃહં વાણિજ્યગૃહં મા
 કાર્ષ | 17 તસ્માત્ તન્મન્દિરાર્થ ઉધોગો યસ્તુ સ ગ્રસતીવ મામ્ | ઇમાં
 શાસ્ત્રીયલિપિં શિષ્યાઃસમસ્મરન્ | 18 તતઃ પરમ્ ચિહ્નદીયલોકા યીષિમવદન્
 તવમિદૃશકર્મકરણાત્ કિં ચિહ્નમસ્માન્ દર્શયસિ? 19 તતો યીશુસ્તાનવોચદ્
 યુષ્માભિરે તસ્મિન્ મન્દિરે નાશિતે દિનત્રયમધ્યેડહં તદ્ ઉત્થાપયિષ્યામિ |
 20 તદા ચિહ્નદિયા વ્યાહાર્ષુઃ, એતસ્ય મન્દિરસ નિર્માણેન ષટ્ચત્વારિંશદ્
 વત્સરા ગતાઃ, ત્વં કિં દિનત્રયમધ્યે તદ્ ઉત્થાપયિષ્યસિ? 21 કિન્તુ સ
 નિજદેહરૂપમન્દિરે કથામિમાં કથિતવાન્ | 22 સ યદેતાદૃશં ગદિતવાન્
 તચ્છિષ્યાઃ શ્મશાનાત્ તદીયોત્થાને સતિ સ્મૃત્વા ધર્મગ્રન્થે યીશુનોક્તકથાયાં
 ચ વ્યશ્વસિષુઃ | 23 અનન્તરં નિસ્તારોત્સવસ્ય ભોજ્યસમયે ચિહ્નશાલમ્
 નગરે તત્ક્રુતાશ્ચર્યકર્માણિ વિલોક્ય બહુભિસ્તસ્ય નામનિ વિશ્વસિતં | 24
 કિન્તુ સ તેષાં કરેષુ સ્વં ન સમર્પયત્, યતઃ સ સર્વાનવૈત્ | 25 સ માનવેષુ
 કસ્યચિત્ પ્રમાણં નાપેક્ષત યતો મનુજાનાં મધ્યે યદદસ્તિ તત્તત્ સોજાનાત્ |

3 નિકદિમનામા ચિહ્નદીયાનામ્ અધિપતિઃ ક્ષિરુશી ક્ષણદાયાં 2
 યીશૌરભ્યાર્ણમ્ આગ્રજ્ય વ્યાહાર્ષીત્, હે ગુરો ભવાન્ ઇશ્વરાદ્ આગત્ એક
 ઉપદેષ્ટ, એતદ્ અસ્માભિર્જાયતે; યતો ભવતા યાન્યાશ્ચર્યકર્માણિ ક્રિયન્તે
 પરમેશ્વરસ્ય સાહાય્યં વિના કેનાપિ તત્તત્કર્માણિ કર્તું ન શક્યન્તે | 3 તદા
 યીશુરુત્તરં દત્તવાન્ તવાહં યથાર્થતરં વ્યાહરામિ પુનર્જન્મનિ ન સતિ કોપિ
 માનવ ઇશ્વરસ્ય રાજ્યં દ્રષ્ટું ન શકનોતિ | 4 તતો નિકદીમઃ પ્રત્યવોચત્
 મનુજો વૃદ્ધો ભૂત્વા કથં જનિષ્યતે? સ કિં પુન માર્તૃજઠરં પ્રવિશ્ય જનિતું

शकनोति? 5 यीशुरवादीद् यथार्थतरम् अहं कथयामि मनुजे तोयात्मभ्यां
 पुन न जाते स एश्वरस्य राज्ञ्यं प्रवेष्टुं न शकनोति। 6 मांसाद् यत्
 जायते तन् मांसमेव तथात्मनो यो जायते स आत्मैव। 7 युष्माभिः
 पुन जनिद्वयं भूमैतस्यां कथायाम् आश्चर्यं मा भंस्थाः। 8 सदागतिर्या
 द्विशमिच्छति तस्यामेव द्विशि वाति, त्वं तस्य स्वनं शुणोषि किन्तु स
 कुत आयाति कुत्र याति वा किमपि न जानासि तद्वाद् आत्मनः सकाशात्
 सव्येषां मनुजानां जन्म भवति। 9 तदा निकटीमः पृष्टवान् अेतत् कथं
 भवितुं शकनोति? 10 यीशुः प्रत्यक्तवान् त्वमिस्रायेलो गुरुर्भूत्वापि किमेतां
 कथां न वेत्सि? 11 तुभ्यं यथार्थं कथयामि, वयं यद् विद्मस्तद् वय्मः यंश्च
 पश्यामस्तस्यैव साक्ष्यं ददाः किन्तु युष्माभिरस्माकं साक्षित्वं न गृह्यते। 12
 अेतस्य संसारस्य कथायां कथितायां यद्दि यूयं न विश्वसिथ तर्हि स्वर्गीयायां
 कथायां कथं विश्वसिष्यथ? 13 यः स्वर्गोऽस्ति यं य स्वर्गाद् अवारोहत् तं
 मानवतनयं विना कोपि स्वर्गं नारोहत्। 14 अपरञ्च भूसा यथा प्रान्तरे सर्पं
 प्रोत्थापितवान् मनुष्यपुत्रोऽपि तथैवोत्थापितव्यः; 15 तस्माद् यः कश्चित्
 तस्मिन् विश्वसिष्यति सोऽविनाश्यः सन् अनन्तायुः प्राप्स्यति। (aiōnios
 g166) 16 एश्वर एत्थं जगद्व्यत यत् स्वमद्वितीयं तनयं प्राददात् ततो यः
 कश्चित् तस्मिन् विश्वसिष्यति सोऽविनाश्यः सन् अनन्तायुः प्राप्स्यति।
 (aiōnios g166) 17 एश्वरो जगतो लोकान् ददत्तुं स्वपुत्रं न प्रेष्य तान्
 परित्रातुं प्रेषितवान्। 18 अतमेव यः कश्चित् तस्मिन् विश्वसिति स
 द्ददाहो न भवति किन्तु यः कश्चित् तस्मिन् न विश्वसिति स एदानीमेव
 द्ददाहो भवति, यतः स एश्वरस्याद्वितीयपुत्रस्य नामनि प्रत्ययं न करोति।
 19 जगतो मध्ये ज्योतिः प्राकाशत किन्तु मनुष्याणां कर्माणां दृष्टत्वात् ते
 ज्योतिषोपि तिभिरे प्रीयन्ते अेतदेव द्ददस्य कारणां भवति। 20 यः कुकर्म्म
 करोति तस्यायारस्य दृष्टत्वात् स ज्योतिर्ऋतीयत्वा तन्निकटे नायाति; 21
 किन्तु यः सत्कर्म्म करोति तस्य सव्वाणि कर्माणि श्वरेण कृतानीति सथा
 प्रकाशते तदभिप्रायेण स ज्योतिषः सन्निधिम् आयाति। 22 ततः परम्
 यीशुः शिष्यैः सार्द्धं यिडूदीयदेशं गत्वा तत्र स्थित्वा मञ्जयितुम् आरभत।
 23 तदा शालम् नगरस्य समीपस्थायिनि अैनन् ग्रामे बहुतरतोयस्थितेस्तत्र
 योहन् अमञ्जयत् तथा य लोका आगत्य तेन मञ्जिता अभवन्। 24

तदा योऽनू कारायां न बद्धः | 25 अपरञ्च शायकर्मणि योऽनः शिष्यैः
 सऽ यिऽदीयलोकानां विवादे जाते, ते योऽनः संन्धिं गत्वाकथयन्, 26
 हे गुरो यद्गननधाः पारे भवता सार्द्धं य आसीत् यस्मिंश्च भवान् साक्ष्यं
 प्रददात् पश्यतु सोऽपि मञ्जयति सर्व्वे तस्य समीपं यान्ति य | 27 तदा
 योऽनू प्रत्यवोयद् एश्वरेण न दत्ते कोऽपि मनुजः किमपि प्राप्तुं न शक्नोति |
 28 अदं अभिषिक्तो न भवामि किन्तु तदग्रे प्रेषितोऽस्मि यामिमां कथां
 कथितवानादं तत्र यूयं सर्व्वे साक्षिणः स्थ | 29 यो जनः कन्यां लभते स
 अेव वरः किन्तु वरस्य सन्निधौ दण्डायमानं तस्य यन्मित्रं तेन वरस्य
 शब्दे श्रुतेऽतीवाह्लाधते ममापि तद्गद् आनन्दसिद्धिर्जाता | 30 तेन कृमशो
 वर्द्धितव्यं किन्तु मया त्सितव्यं | 31 य ार्ध्वादागच्छत् स सर्व्वेषां भुष्यो
 यश्च संसाराद् उदपधत स सांसारिकः संसारीयां कथाञ्च कथयति यस्तु
 स्वर्गादागच्छत् स सर्व्वेषां भुष्यः | 32 स यदपश्यदृशोऽय्य तस्मिन्नेव
 साक्ष्यं ददाति तथापि प्रायशः कश्चित् तस्य साक्ष्यं न गृह्णाति; 33 किन्तु यो
 गृह्णाति स एश्वरस्य सत्यवादित्वं मुद्राङ्कितं करोति | 34 एश्वरेण यः प्रेरितः
 सअेव एश्वरीयकथां कथयति यत एश्वर आत्मानं तस्मै अपरिमितम्
 अददात् | 35 पिता पुत्रे स्नेहं कृत्वा तस्य हस्ते सर्वाणि समर्पितवान् | 36
 यः कश्चित् पुत्रे विश्वसिति स अेवानन्तम् परमायुः प्राप्नोति किन्तु यः
 कश्चित् पुत्रे न विश्वसिति स परमायुषो दर्शनं न प्राप्नोति किन्तु एश्वरस्य
 कोपभाजनं भूत्वा तिष्ठति | (aiṅnios g166)

4 यीशुः स्वयं नामञ्जयत् केवलं तस्य शिष्या अमञ्जयत् किन्तु
 योऽनोऽधिकशिष्यान् स करोति मञ्जयति य, 2 डिऽशिन एमां
 वार्तामशृण्वन् एति प्रभुरवगत्य 3 यिऽदीयदेशं विहाय पुन गर्लीलम्
 आगत | 4 ततः शोमिरोणप्रदेशस्य मधेन तेन गन्तव्ये सति 5 याकूब्
 निजपुत्राय यूषडे यां भूमिम् अददात् तत्समीपस्थायि शोमिरोणप्रदेशस्य
 सुभार् नाम्ना विख्यातस्य नगरस्य सन्निधावुपास्थात् | 6 तत्र याकूब्ः
 प्रहिरासीत्; तदा द्वितीययामवेलायां जातायां स मार्गे श्रमापन्नस्तस्य प्रडेः
 पार्श्वे उपाविशत् | 7 अेतर्हि कायित् शोमिरोणीया योषित् तोयोत्तोलनार्थम्
 तत्रागतम् 8 तदा शिष्याः षाधद्रव्याणि केतुं नगरम् अगच्छन् | 9 यीशुः
 शोमिरोणीयां तां योषितम् व्याडार्षीत् मह्यं किञ्चित् पानीयं पातुं देहि |

કિન્તુ શોમિરોણીયૈઃ સાકં ચિહ્નૈયલોકા ન વ્યવાહરન્ તસ્માદ્વેતોઃ સાકથયત્
 શોમિરોણીયા ચોષિતદહં ત્વં ચિહ્નૈયોસિ કથં મત્તઃ પાનીયં પાતુમ્ ઇચ્છસિ?
 10 તતો યીશુરવદદ્ ઇશ્વરસ્ય યદ્વાનં તત્કીદૃક્ પાનીયં પાતું મહાં દેહિ ય ઇત્યં
 ત્વાં યાયતે સ વા ક ઇતિ ચેદજ્ઞાસ્યથાસ્તર્હિં તમયાચિષ્યથાઃ સ ય તુભ્યમમૃતં
 તોયમદાસ્યત્ | 11 તદા સા સીમન્તિની ભાષિતવતિ, હે મહેચ્છ પ્રહિર્ગમ્બીરો
 ભવતો નીરોત્તોલનપાત્રં નાસ્તી ય તસ્માત્ તદમૃતં કીલાલં કુતઃ પ્રાપ્સ્યસિ?
 12 યોસ્મભ્યમ્ ઇમમન્દૂં દદૌ, યસ્ય ય પરિજના ગોમેષાદયશ્ચ સર્વોડસ્ય પ્રહેઃ
 પાનીયં પપુરેતાદૃશો યોસ્માકં પૂર્વપુરુષો યાકૂબ્ તસ્માદપિ ભવાન્ મહાન્
 કિં? 13 તતો યીશુરકથયદ્ ઇદં પાનીયં સઃ પિવતિ સ પુનસ્તૃષાત્તો ભવિષ્યતિ,
 14 કિન્તુ મયા દત્તં પાનીયં યઃ પિવતિ સ પુનઃ કદાપિ તૃષાત્તો ન ભવિષ્યતિ |
 મયા દત્તમ્ ઇદં તોયં તસ્યાન્તઃ પ્રસ્રવણરૂપં ભૂત્વા અનન્તાયુર્યાવત્ સ્ત્રોષ્યતિ |
 (aiōn g165, aiōnios g166) 15 તદા સા વનિતાકથયત્ હે મહેચ્છ તર્હિં
 મમ પુનઃ પીપાસા યથા ન જાયતે તોયોત્તોલનાય યથાત્રાગમનં ન ભવતિ
 ય તદર્થં મહાં તત્તોયં દેહી | 16 તતો યીશુરવદદધાહિ તવ પતિમાહૂય
 સ્થાનેડત્રાગચ્છ | 17 સા વામાવદત્ મમ પતિર્નાસ્તિ | યીશુરવદત્ મમ
 પતિર્નાસ્તીતિ વાક્યં ભદ્રમવોયઃ | 18 યતસ્તવ પત્ર પતયોભવન્ અધુના તુ
 ત્વયા સાદ્ધં યસ્તિષ્ઠતિ સ તવ ભર્તા ન વાક્યમિદં સત્યમવાદિઃ | 19 તદા સા
 મહિલા ગદિતવતિ હે મહેચ્છ ભવાન્ એકો ભવિષ્યદ્વાદીતિ બુદ્ધ મયા | 20
 અસ્માકં પિતૃલોકા એતસ્મિન્ શિલોચ્યયેડભજન્ત, કિન્તુ ભવદ્ધિરુચ્યતે
 ચિરુશાલમ્ નગરે ભજનયોગ્યં સ્થાનમાસ્તે | 21 યીશુરવોયત્ હે ચોષિત્
 મમ વાક્યે વિશ્વસિહિ યદા યૂયં કેવલશૈલેડસ્મિન્ વા ચિરુશાલમ્ નગરે
 પિતુર્ભજનં ન કરિષ્યધ્વે કાલ એતાદૃશ આયાતિ | 22 યૂયં યં ભજધ્વે
 તં ન જાનીથ, કિન્તુ વયં યં ભજામહે તં જાનીમહે, યતો ચિહ્નૈયલોકાનાં
 મધ્યાત્ પરિત્રાણં જાયતે | 23 કિન્તુ યદા સત્યભક્તા આત્મના સત્યરૂપેણ
 ય પિતુર્ભજનં કરિષ્યન્તે સમય એતાદૃશ આયાતિ, વરમ્ ઇદાનીમપિ વિધતે;
 યત એતાદૃશો ભક્તાન્ પિતા ચેષ્ટતે | 24 ઇશ્વર આત્મા; તતસ્તસ્ય યે
 ભક્તાસ્તૈઃ સ આત્મના સત્યરૂપેણ ય ભજનીયઃ | 25 તદા સા મહિલાવાદીત્
 ખ્રીષ્ટનામ્ના વિખ્યાતોડભિષિક્તઃ પુરુષ આગમિષ્યતીતિ જાનામિ સ ય
 સર્વાઃ કથા અસ્માન્ જ્ઞાપયિષ્યતિ | 26 તતો યીશુરવદત્ ત્વયા સાદ્ધં

કથનં કરોમિ યોડહમ્ અહમેવ સ પુરુષઃ | 27 એતસ્મિન્ સમયે શિષ્યા
 આગત્ય તથા સ્ત્રિયા સાદ્ધ્વં તસ્ય કથોપકથને મહાશ્ચર્યમ્ અમન્યન્ત તથાપિ
 ભવાન્ કિમિચ્છતિ? યદ્વા કિમર્થમ્ એતયા સાદ્ધ્વં કથાં કથયતિ? ઇતિ
 કોપિ નાપૃચ્છત્ | 28 તતઃ પરં સા નારી કલશં સ્થાપયિત્વા નગરમધ્યં
 ગત્વા લોકેભ્યોકથાયદ્ 29 અહં યદ્યત્ કર્મ્માકરવં તત્સર્વ્યં મહ્યમકથયદ્
 એતાદૃશં માનવમેકમ્ આગત્ય પશ્યત રુ કિમ્ અભિષિક્તો ન ભવતિ?
 30 તતસ્તે નગરાદ્ બહિરાગત્ય તાતસ્ય સમીપમ્ આયન્ | 31 એતર્હિ
 શિષ્યાઃ સાધયિત્વા તં વ્યાહાર્ષુઃ હે ગુરો ભવાન્ કિચ્છિદ્ ભૂક્તાં | 32 તતઃ
 સોવદદ્ યુષ્માભિર્યન્ન જ્ઞાયતે તાદૃશં ભક્ષ્યં મમાસ્તે | 33 તદા શિષ્યાઃ
 પરસ્પરં પ્રજુમ્ આરભન્ત, કિમસ્મૈ કોપિ કિમપિ ભક્ષ્યમાનીય દત્તવાન્? 34
 યીશુરવોચત્ મત્પ્રેરકસ્યાભિમતાનુરૂપકરણં તસ્યૈવ કર્મ્માસિદ્ધિકારણઞ્ચ
 મમ ભક્ષ્યં | 35 માસયતુષ્ટયે જાતે શસ્યકર્ત્તનસમયો ભવિષ્યતીતિ વાક્યં
 યુષ્માભિઃ કિં નોદતે? કિન્ત્વહં વદામિ, શિર ઉત્તોલ્ય ક્ષેત્રાણિ પ્રતિ નિરીક્ષ્ય
 પશ્યત, ઇદાનીં કર્ત્તનયોગ્યાનિ શુક્લવર્ણાન્યભવન્ | 36 યશ્ચિનત્તિ સ
 વેતનં લભતે અનન્તાયુઃસ્વરૂપં શસ્યં સ ગૃહ્ણાતિ ચ, તેનૈવ વપ્તા છેન્તા ચ
 યુગપદ્ આનન્દતઃ | (aiōnios g166) 37 ઇત્યં સતિ વપત્યેકશ્ચિનત્યન્ય ઇતિ
 વચનં સિદ્ધયતિ | 38 યત્ર યૂયં ન પર્યશ્રામ્યત તાદૃશં શસ્યં છેતું યુષ્માન્
 પ્રૈરયમ્ અન્યે જનાઃપર્યશ્રામ્યન્ યૂયં તેષાં શ્રગસ્ય ફલમ્ અલભધ્વમ્ | 39
 યસ્મિન્ કાલે યદ્યત્ કર્મ્માકાર્ષં તત્સર્વ્યં સ મહ્યમ્ અકથયત્ તસ્યા વનિતાયા
 ઇદં સાક્ષ્યવાક્યં શ્રુત્વા તન્નગરનિવાસિનો બહવઃ શોમિરોણીયલોકા
 વ્યશ્વસન્ | 40 તથા ચ તસ્યાન્તિકે સમુપસ્થાય સ્વેષાં સન્નિઘૌ કતિચિદ્
 દિનાનિ સ્થાતું તસ્મિન્ વિનયમ્ અકુર્વાન તસ્માત્ સ દિનદ્વયં તત્સ્થાને
 ન્યવષ્ટત્ 41 તતસ્તસ્યોપદેશેન બહવોડપરે વિશ્વસ્ય 42 તાં યોષામવદન્
 કેવલં તવ વાક્યેન પ્રતીમ ઇતિ ન, કિન્તુ સ જગતોડભિષિક્તસ્ત્રાતેતિ
 તસ્ય કથાં શ્રુત્વા વયં સ્વયમેવાજ્ઞાસમહિ | 43 સ્વદેશે ભવિષ્યદ્વક્તુઃ
 સત્કારો નાસ્તીતિ યદ્યપિ યીશુઃ પ્રમાણં દત્વાકથયત્ 44 તથાપિ દિવસદ્વયાત્
 પરં સ તસ્માત્ સ્થાનાદ્ ગાલીલં ગતવાન્ | 45 અનન્તરં ચે ગાલીલી
 લિયલોકા ઉત્સવે ગતા ઉત્સવસમયે યિરૂશલમ્ નગરે તસ્ય સર્વાઃ ક્રિયા
 અપશ્યન્ તે ગાલીલમ્ આગતં તમ્ આગૃહ્ણન્ | 46 તતઃ પરમ્ યીશુ યસ્મિન્

કાન્નાનગરે જલં દ્રાક્ષારસમ્ આકરોત્ તત્ સ્થાનં પુનરગાત્ | તસ્મિન્નેવ
 સમયે કસ્યચિદ્ રાજસભાસ્તારસ્ય પુત્રઃ કઠ્ઠનાહૂમપુરી રોગગ્રસ્ત આસીત્ |
 47 સ ચેહૂદીયદેશાદ્ યીશો ગાલીલાગમનવાર્તાં નિશમ્ય તસ્ય સમીપં ગત્વા
 પ્રાર્થ્યં વ્યાહતવાન્ મમ પુત્રસ્ય પ્રાયેણ કાલ આસન્નઃ ભવાન્ આગત્ય
 તં સ્વસ્થં કરોતુ | 48 તદા યીશુરકથયદ્ આશ્ચર્યં કર્મ ચિત્રં ચિહ્નં ચ
 ન દૃષ્ટા યૂયં ન પ્રત્યેષ્યથ | 49 તતઃ સ સભાસદવદત્ હે મહેચ્છ મમ
 પુત્રે ન મૃતે ભવાનાગચ્છતુ | 50 યીશુસ્તમવદદ્ ગચ્છ તવ પુત્રોડજીવીત્
 તદા યીશુનોક્તવાક્યે સ વિશ્વસ્ય ગતવાન્ | 51 ગમનકાલે માર્ગમધ્યે
 દાસાસ્તં સાક્ષાત્પ્રાપ્યાવદન્ ભવતઃ પુત્રોડજીવીત્ | 52 તતઃ કં કાલમારભ્ય
 રોગપ્રતીકારારમ્ભો જાતા ઇતિ પૃષ્ઠે તૈરુક્તં દ્વાઃ સાર્દ્દદ્વયાધિકદ્વિતીયયામે
 તસ્ય જ્વરત્યાગોડભવત્ | 53 તદા યીશુસ્તસ્મિન્ ક્ષણે પ્રોક્તવાન્ તવ
 પુત્રોડજીવીત્ પિતા તદ્દુઃખ્યા સપરિવારો વ્યશ્વસીત્ | 54 ચિહૂદીયદેશાદ્
 આગત્ય ગાલીલિ યીશુરેતદ્ દ્વિતીયમ્ આશ્ચર્યકર્માકરોત્ |

5 તતઃ પરં ચિહૂદીયાનામ્ ઉત્સવ ઉપસ્થિતે યીશુ ચિરૂશાલમં ગતવાન્ |
 2 તસ્મિન્નગરે મેષનામ્નો દ્વારસ્ય સમીપે ઇબ્રીયભાષયા ભૈથેસ્દા નામ્ના
 પિષ્કરિણી પઞ્ચઘટ્ટુકતાસીત્ | 3 તસ્યાસ્તેષુ ઘટ્ટેષુ કિલાલકમ્પનમ્ અપેક્ષ્ય
 અન્ધપઞ્ચશુષ્કાઙ્ગાદયો બહવો રોગિણઃ પતન્તસ્તિષ્ઠન્તિ સ્મ | 4 યતો
 વિશેષકાલે તસ્ય સરસો વારિ સ્વર્ગીયદૂત એત્યાકમ્પયત્ તત્કીલાલકમ્પનાત્
 પરં યઃ કશ્ચિદ્ રોગી પ્રથમં પાનીયમવારોહત્ સ એવ તત્ક્ષણાદ્
 રોગમુક્તોડભવત્ | 5 તદાષ્ટાત્રિંશદ્ધર્ષાણિ યાવદ્ રોગગ્રસ્ત એકજનસ્તસ્મિન્
 સ્થાને સ્થિતવાન્ | 6 યીશુસ્તં શયિતં દૃષ્ટ્વા બહુકાલિકરોગીતિ ઙ્ઞાત્વા
 વ્યાહતવાન્ ત્વં કિં સ્વસ્થો બુભૂષસિ? 7 તતો રોગી કથિતવાન્ હે મહેચ્છ યદા
 કીલાલં કમ્પતે તદા માં પુષ્કરિણીમ્ અવરોહયિતું મમ કોપિ નાસ્તિ, તસ્માન્
 મમ ગમનકાલે કશ્ચિદન્યોડગ્રો ગત્વા અવરોહતિ | 8 તદા યીશુરકથયદ્
 ઉત્તિષ્ઠ, તવ શય્યામુતોલ્ય ગૃહીત્વા યાહિ | 9 સ તત્ક્ષણાત્ સ્વસ્થો ભૂત્વા
 શય્યામુતોલ્યાદાય ગતવાન્ કિન્તુ તદિનં વિશ્રામવારઃ | 10 તસ્માદ્ ચિહૂદીયાઃ
 સ્વસ્થં નરં વ્યાહરન્ અધ વિશ્રામવારે શયનીયમાદાય ન યાતવ્યમ્ | 11
 તતઃ સ પ્રત્યવોચદ્ યો માં સ્વસ્થમ્ અકાર્ષીત્ શયનીયમ્ ઉત્તોલ્યાદાય
 યાતું માં સ એવાદિશત્ | 12 તદા તેડપૃચ્છન્ શયનીયમ્ ઉત્તોલ્યાદાય

યાતું ય આજ્ઞાપયત્ સ કઃ? 13 કિન્તુ સ ક ઇતિ સ્વસ્થીભૂતો નાજાનાદ્
 યતસ્તસ્મિન્ સ્થાને જનતાસત્વાદ્ યીશુઃ સ્થાનાન્તરમ્ આગમત્ | 14 તતઃ
 પરં યેશુ મન્દિરે તં નરં સાક્ષાત્રાપ્યાકથયત્ પશ્યેદાનીમ્ અનામયો જાતોસિ
 યથાધિકા દુર્દશા ન ઘટતે તદ્વેતોઃ પાપં કર્મ પુનર્માકાર્ષીઃ | 15 તતઃ સ ગત્વા
 ચિહ્નૂદીયાન્ અવદદ્ યીશુ માર્મ્ અરોગિણમ્ અકાર્ષીત્ | 16 તતો યીશુ
 વિશ્રામવારે કર્મદૃશં કૃતવાન્ ઇતિ હેતો ચિહ્નૂદીયાસ્તં તાડયિત્વા હન્તુમ્
 અચેષ્ટન્ત | 17 યીશુસ્તાનાખ્યત્ મમ પિતા યત્ કાર્ય્યં કરોતિ તદનુરૂપમ્
 અહમપિ કરોતિ | 18 તતો ચિહ્નૂદીયાસ્તં હન્તુ પુનરયતન્ત યતો વિશ્રામવારં
 નામન્યત તદેવ કેવલં ન અધિકન્તુ ઇશ્વરં સ્વપિતરં પ્રોચ્ય સ્વમપીશ્વરતુલ્યં
 કૃતવાન્ | 19 પશ્ચાદ્ યીશુરવદદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ પુત્રઃ પિતરં
 યદત્ કર્મ કુર્વન્તં પશ્યતિ તદતિરિક્તં સ્વેચ્છાતઃ કિમપિ કર્મ કર્તુ ન
 શકનોતિ | પિતા યત્ કરોતિ પુત્રોપિ તદેવ કરોતિ | 20 પિતા પુત્રે સ્નેહં
 કરોતિ તસ્માત્ સ્વયં યદત્ કર્મ કરોતિ તત્સર્વ્યં પુત્રં દર્શયતિ; યથા ય
 યુષ્માકં આશ્ચર્યજ્ઞાનં જનિષ્યતે તદર્થમ્ ઇતોપિ મહાકર્મ તં દર્શયિષ્યતિ |
 21 વસ્તુતસ્તુ પિતા યથા પ્રમિતાન્ ઉત્થાપ્ય સજિવાન્ કરોતિ તદ્વત્ પુત્રોપિ
 યં યં ઇચ્છતિ તં તં સજીવં કરોતિ | 22 સર્વ્યં પિતરં યથા સત્કુર્વન્તિ તથા
 પુત્રમપિ સત્કારયિતું પિતા સ્વયં કસ્યાપિ વિચારમકૃત્વા સર્વ્યવિચારાણાં
 ભારં પુત્રે સમર્પિતવાન્ | 23 યઃ પુત્રં સત્ કરોતિ સ તસ્ય પ્રેરકમપિ સત્
 કરોતિ | 24 યુષ્માનાહં યથાર્થતરં વદામિ યો જનો મમ વાક્યં શ્રુત્વા મત્પ્રેરકે
 વિશ્વસિતિ સોનન્તાયુઃ પ્રાપ્નોતિ કદાપિ દણ્ડબાજનં ન ભવતિ નિધનાદુત્થાય
 પરમાયુઃ પ્રાપ્નોતિ | (aiōnios g166) 25 અહં યુષ્માનતિયથાર્થં વદામિ યદા
 મૃતા ઇશ્વરપુત્રસ્ય નિનાદં શ્રોષ્યન્તિ યે ય શ્રોષ્યન્તિ તે સજીવા ભવિષ્યન્તિ
 સમય એતાદૃશ આયાતિ વરમ્ ઇદાનીમખ્યુપતિષ્ઠતિ | 26 પિતા યથા
 સ્વયઞ્ઞીવી તથા પુત્રાય સ્વયઞ્ઞીવિત્વાધિકારં દત્તવાન્ | 27 સ મનુષ્યપુત્રઃ
 એતસ્માત્ કારણાત્ પિતા દણ્ડકરણાધિકારમપિ તસ્મિન્ સમર્પિતવાન્ | 28
 એતદર્થે યૂયમ્ આશ્ચર્ય્યં ન મન્યધ્વં યતો યસ્મિન્ સમયે તસ્ય નિનાદં શ્રુત્વા
 શ્મશાનસ્થાઃ સર્વ્યં બહિરાગમિષ્યન્તિ સમય એતાદૃશ ઉપસ્થાસ્યતિ | 29
 તસ્માદ્ યે સત્કર્માણિ કૃતવન્તસ્ત ઉત્થાય આયુઃ પ્રાપ્સ્યન્તિ યે ય કુકર્માણિ
 કૃતવન્તસ્ત ઉત્થાય દણ્ડં પ્રાપ્સ્યન્તિ | 30 અહં સ્વયં કિમપિ કર્તુ ન શકનોમિ

यथा शुश्रोमि तथा विचारयामि मम विचारञ्च न्याय्यः यतोऽहं स्वीयात्मीष्टं
 नेहित्वा मत्प्रेरयितुः पितुरिष्टम् एते | 31 यदि स्वस्मिन् स्वयं साक्ष्यं ददामि
 तर्हि तत्साक्ष्यम् आग्राह्यं भवति; 32 किन्तु मर्त्येऽपरो जनः साक्ष्यं ददाति
 मर्त्ये तस्य यत् साक्ष्यं तत् सत्यम् अतएव्यहं जानामि | 33 युष्माभि
 योऽहं प्रति लोकेषु प्रेरितेषु स सत्यकथायां साक्ष्यमददात् | 34 मानुषादहं
 साक्ष्यं नोपेक्षे तथापि यूयं यथा परित्रयध्वे तदर्थम् एतं वाक्यं वदामि | 35
 योऽहं देदीप्यमानो दीप एव तेजस्वी स्थितवान् यूयम् अल्पकालं तस्य
 दीपनानन्दितुं सममन्यध्वं | 36 किन्तु तत्रमाणादपि मम गुरुतरं प्रमाणं
 विद्यते पिता मां प्रेष्य यद्यत् कर्म समापयितुं शक्तिमददात् मया कृतं तत्तत्
 कर्म मर्त्ये प्रमाणं ददाति | 37 यः पिता मां प्रेरितवान् भोपि मर्त्ये प्रमाणं
 ददाति | तस्य वाक्यं युष्माभिः कदापि न श्रुतं तस्य उपरं न दृष्टं 38 तस्य
 वाक्यञ्च युष्माकम् अन्तः कदापि स्थानं नाप्नोति यतः स यं प्रेषितवान्
 यूयं तस्मिन् न विश्वसिथ | 39 धर्मपुस्तकानि यूयम् आलोचयध्वं तै
 र्वाक्यैरनन्तायुः प्राप्स्याम एति यूयं बुध्यध्वे तद्भर्मपुस्तकानि मर्त्ये प्रमाणं
 ददति | (aiōnios g166) 40 तथापि यूयं परमायुःप्राप्तये मम संनिधिम् न
 जिगमिषथ | 41 अहं मानुषेभ्यः सत्कारं न गृह्णामि | 42 अहं युष्मान्
 जानामि; युष्माकमन्तरं ईश्वरप्रेम नास्ति | 43 अहं निजपितुर्नाम्नागतोस्मि
 तथापि मां न गृह्णीथ किन्तु कश्चिद् यदि स्वनाम्ना समागमिष्यति तर्हि तं
 ग्रहीष्यथ | 44 यूयम् ईश्वरात् सत्कारं न यिष्टत्वा केवलं परस्परं सत्कारम्
 येद् आदध्व्ये तर्हि कथं विश्वसितुं शक्नुथ? 45 पुतुः समीपेऽहं युष्मान्
 अपवदिष्यामीति मा यिन्तयत यस्मिन्, यस्मिन् युष्माकं विश्वसः सअेव
 भूसा युष्मान् अपवदति | 46 यदि यूयं तस्मिन् विश्वसिष्यत तर्हि मय्यपि
 विश्वसिष्यत, यत् स मयि लिभितवान् | 47 ततो यदि तेन लिभितवानि न
 प्रतिथ तर्हि मम वाक्यानि कथं प्रत्येष्यथ?

6 ततः परं यीशुर्गालीलू प्रदेशीयस्य तिविरियानाम्नः सिन्धोः पारं गतवान् |
 2 ततो व्याधिमल्लोकस्वास्थ्यकराण्युपाणि तस्याश्चर्याणि कर्माणि दृष्ट्वा
 भडवो जनास्तत्पश्चाद् अगच्छन् | 3 ततो यीशुः पर्वतमारुह्य तत्र
 शिष्यैः साकम् | 4 तस्मिन् समये निस्तारोत्सवनाग्निं यिडूदीयानाम्
 उत्सव उपस्थिते 5 यीशुर्नेत्रे उत्तोल्य भडुलोकान् स्वसमीपागतान्

વિલોક્ય કિલિપં પૃષ્ઠવાન્ એતેષાં ભોજનાય ભોજદ્રવ્યાણિ વયં કુત્ર કેતું
 શક્તુમ્? 6 વાક્યમિદં તસ્ય પરીક્ષાર્થમ્ અવાદીત્ કિન્તુ યત્ કરિષ્યતિ
 તત્ સ્વયમ્ અજાનાત્ | 7 કિલિપઃ પ્રત્યવોચત્ એતેષામ્ એકૈકો યદલ્પમ્
 અલ્પં પ્રાપ્નોતિ તર્હિ મુદ્રાપાદદ્વિશતેન કીતપૂપા અપિ ન્યૂના ભવિષ્યન્તિ |
 8 શિમોન્ પિતરસ્ય ભ્રાતા આન્દ્રિયાખ્યઃ શિષ્યાણામેકો વ્યાહતવાન્ 9
 અત્ર કસ્યચિદ્ બાલકસ્ય સમીપે પત્ર યાવપૂપાઃ ક્ષુદ્રમત્સ્યદ્વયત્ર સન્તિ
 કિન્તુ લોકાનાં એતાવાતાં મધ્યે તૈઃ કિં ભવિષ્યતિ? 10 પશ્ચાદ્ યીશુરવદત્
 લોકાનુપવેશયત તત્ર બહુયવસસત્વાત્ પત્રસહસ્ત્રેભ્યો ન્યૂના અધિકા વા
 પુરુષા ભૂમ્યામ્ ઉપાવિશન્ | 11 તતો યીશુસ્તાન્ પૂપાનાદાય ઈશ્વરસ્ય
 ગુણાન્ કીર્તયિત્વા શિષ્યેષુ સમાર્પયત્ તતસ્તે તેભ્ય ઉપવિષ્ટલોકેભ્યઃ પૂપાન્
 યથેષ્ટમત્સ્યત્ર પ્રાદુઃ | 12 તેષુ તૃપ્તેષુ સ તાનવોચદ્ એતેષાં કિન્દ્રિદપિ
 યથા નાપચીયતે તથા સર્વાણ્યવશિષ્ટાનિ સંગૃહ્ણીત | 13 તતઃ સર્વેષાં
 ભોજનાત્ પરં તે તેષાં પત્રાનાં યાવપૂપાનાં અવશિષ્ટાન્યખિલાનિ સંગૃહ્ય
 દ્વાદશલ્લકાન્ અપૂરયન્ | 14 અપરં યીશોરેતાદૃશીમ્ આશ્ચર્યક્રિયાં દૃષ્ટ્વા
 લોકા મિથો વક્તુમારેભિરે જગતિ યસ્યાગમનં ભવિષ્યતિ સ એવાયમ્
 અવશ્યં ભવિષ્યદ્ગત્તા | 15 અતએવ લોકા આગત્ય તમાકમ્ય રાજાનં
 કરિષ્યન્તિ યીશુસ્તેષામ્ ઈદૃશં માનસં વિજ્ઞાય પુનશ્ચ પર્વતમ્ એકાકી
 ગતવાન્ | 16 સાયંકાલ ઉપસ્થિતે શિષ્યા જલધિતટં પ્રજિત્વા નાવમારુહ્ય
 નગરદિશિ સિન્ધૌ વાહયિત્વાગમન્ | 17 તસ્મિન્ સમયે તિમિર ઉપાતિષ્ઠત્
 કિન્તુ યીષુસ્તેષાં સમીપં નાગચ્છત્ | 18 તદા પ્રબલપવનવહનાત્ સાગરે
 મહાતરજ્ઞો ભવિતુમ્ આરેભે | 19 તતસ્તે વાહયિત્વા દ્વિત્રાન્ ક્રોશાન્ ગતાઃ
 પશ્ચાદ્ યીશું જલધેરુપરિ પદ્ભ્યાં પ્રજન્તં નૌકાન્તિકમ્ આગચ્છન્તં વિલોક્ય
 ત્રાસયુક્તા અભવન્ 20 કિન્તુ સ તાનુક્તવાન્ અયમહં મા ભૈષ્ટ | 21 તદા તે
 તં સ્વૈરં નાવિ ગૃહીતવન્તઃ તદા તત્ક્ષણાદ્ ઉદ્દિષ્ટસ્થાને નૌરુપાસ્થાત્ | 22
 યથા નાવા શિષ્યા અગચ્છન્ તદન્યા કાપિ નૌકા તસ્મિન્ સ્થાને નાસીત્ તતો
 યીશુઃ શિષ્યૈઃ સાકં નાગમત્ કેવલાઃ શિષ્યા અગમન્ એતત્ પારસ્થા લોકા
 જ્ઞાતવન્તઃ | 23 કિન્તુ તતઃ પરં પ્રભુ યત્ર ઈશ્વરસ્ય ગુણાન્ અનુકીર્ત્ય લોકાન્
 પૂપાન્ અભોજયત્ તત્સ્થાનસ્ય સમીપસ્થતિવિરિયાયા અપરાસ્તરણય
 આગમન્ | 24 યીશુસ્તત્ર નાસ્તિ શિષ્યા અપિ તત્ર ના સન્તિ લોકા

ઇતિ વિજ્ઞાય યીશું ગવેષયિતું તરણિભિઃ કફ્નાહૂમ્ પુરં ગતાઃ | 25 તતસ્તે સરિત્યતેઃ પારે તં સાક્ષાત્ પ્રાપ્ય પ્રાવોચન્ હે ગુરો ભવાન્ અત્ર સ્થાને કદાગમત્? 26 તદા યીશુસ્તાન્ પ્રત્યવાદીદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ આશ્ચર્યકર્મદર્શનાદ્દેતો ન કિન્તુ પૂપભોજનાત્ તેન તૃપ્તત્વાઞ્ચ માં ગવેષયથ | 27 ક્ષયણીયભક્ષ્યાર્થં મા શ્રામિષ્ટ કિન્વન્તાયુર્ભક્ષ્યાર્થં શ્રામ્યત, તસ્માત્ તાદૃશં ભક્ષ્યં મનુજપુત્રો યુષ્માભ્યં દાસ્યતિ; તસ્મિન્ તાત ઈશ્વરઃ પ્રમાણં પ્રાદાત્ | (aiōnios g166) 28 તદા તેડપૃચ્છન્ ઈશ્વરાભિમતં કર્મ કર્તુમ્ અસ્માભિઃ કિં કર્તવ્યં? 29 તતો યીશુરવદદ્ ઈશ્વરો યં પ્રૈરયત્ તસ્મિન્ વિશ્વસનમ્ ઈશ્વરાભિમતં કર્મ | 30 તદા તે વ્યાહરન્ ભવતા કિં લક્ષણં દર્શિતં યદ્દૃષ્ટ્વા ભવતિ વિશ્વસિષ્યામઃ? ત્વયા કિં કર્મ કૃતં? 31 અસ્માકં પૂર્વપુરુષા મહાપ્રાન્તરે માન્નાં ભોક્તું પ્રાપુઃ યથા લિપિરાસ્તે | સ્વર્ગીયાણિ તુ ભક્ષ્યાણિ પ્રદદૌ પરમેશ્વરઃ | 32 તદા યીશુરવદદ્ અહં યુષ્માનતિયથાર્થં વદામિ મૂસા યુષ્માભ્યં સ્વર્ગીયં ભક્ષ્યં નાદાત્ કિન્તુ મમ પિતા યુષ્માભ્યં સ્વર્ગીયં પરમં ભક્ષ્યં દદાતિ | 33 યઃ સ્વર્ગાદવરુહ્ય જગતે જીવનં દદાતિ સ ઈશ્વરદત્તભક્ષ્યરૂપઃ | 34 તદા તે પ્રાવોચન્ હે પ્રભો ભક્ષ્યમિદં નિત્યમસ્મભ્યં દદાતુ | 35 યીશુરવદદ્ અહમેવ જીવનરૂપં ભક્ષ્યં યો જનો મમ સન્નિધિમ્ આગચ્છતિ સ જાતુ ક્ષુધાર્તો ન ભવિષ્યતિ, તથા યો જનો માં પ્રત્યેતિ સ જાતુ તૃષાર્તો ન ભવિષ્યતિ | 36 માં દૃષ્ટ્વાપિ યૂયં ન વિશ્વસિથ યુષ્માનહમ્ ઇત્યવોચં | 37 પિતા મહ્યં યાવતો લોકાનદદાત્ તે સર્વ્ય એવ મમાન્તિકમ્ આગમિષ્યન્તિ યઃ કશ્ચિચ્ચ મમ સન્નિધિમ્ આયાસ્યતિ તં કેનાપિ પ્રકારેણ ન દૂરીકરિષ્યામિ | 38 નિજાભિમતં સાધયિતું ન હિ કિન્તુ પ્રેરયિતુરભિમતં સાધયિતું સ્વર્ગાદ્ આગતોસ્મિ | 39 સ યાન્ યાન્ લોકાન્ મહ્યમદદાત્ તેષામેકમપિ ન હારયિત્વા શેષદિને સર્વાનહમ્ ઉત્થાપયામિ ઇદં મત્પ્રેરયિતુઃ પિતુરભિમતં | 40 યઃ કશ્ચિન્ માનવસુતં વિલોક્ય વિશ્વસિતિ સ શેષદિને મયોત્થાપિતઃ સન્ અનન્તાયુઃ પ્રાપ્સ્યતિ ઇતિ મત્પ્રેરકસ્યાભિમતં | (aiōnios g166) 41 તદા સ્વર્ગાદ્ યદ્ ભક્ષ્યમ્ અવારોહત્ તદ્ ભક્ષ્યમ્ અહમેવ ચિહ્નૂદીયલોકાસ્તસ્યૈતદ્ વાક્યે વિવદમાના વક્તુમારેભિરે 42 યૂષ્કઃ પુત્રો યીશુ ર્યસ્ય માતાપિતરૌ વયં જાનીમ એષ કિં સએવ ન? તર્હિ સ્વર્ગાદ્ અવારોહમ્ ઇતિ વાક્યં કથં વક્તિ? 43 તદા યીશુસ્તાન્ પ્રત્યવદત્ પરસ્પરં

મા વિવદધ્વં 44 મત્પ્રેરકેણ પિત્રા નાકૃષ્ટઃ કોપિ જનો મમાન્તિકમ્ આયાતું
 ન શકનોતિ કિન્ત્વાગતં જનં ચરમેડક્ષિ પ્રોત્થાપયિષ્યામિ | 45 તે સર્વ
 ઇશ્વરેણ શિક્ષિતા ભવિષ્યન્તિ ભવિષ્યદ્વાદિનાં ગ્રન્થેષુ લિપિરિત્યમાસ્તે
 અતો યઃ કશ્ચિત્ પિતુઃ સકાશાત્ શ્રુત્વા શિક્ષતે સ એવ મમ સમીપમ્
 આગમિષ્યતિ | 46 ય ઇશ્વરાદ્ અજાયત તં વિના કોપિ મનુષ્યો જનકં
 નાદર્શત્ કેવલઃ સએવ તાતમ્ અદ્રાક્ષીત્ | 47 અહં યુષ્માન્ યથાર્થતરં
 વદામિ યો જનો મયિ વિશ્વાસં કરોતિ સોનન્તાયુઃ પ્રાપ્નોતિ | (aiōnios
 g166) 48 અહમેવ તજજીવનભક્ષ્યં | 49 યુષ્માકં પૂર્વપુરુષા મહાપ્રાન્તરે
 મન્નાભક્ષ્યં ભૂક્તાપિ મૃતાઃ 50 કિન્તુ યદ્ભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ તદ્ યદિ કશ્ચિદ્
 ભુક્તે તર્હિ સ ન મિચતે | 51 યજજીવનભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ સોહમેવ
 ઇદં ભક્ષ્યં યો જનો ભુક્તે સ નિત્યજીવી ભવિષ્યતિ | પુનશ્ચ જગતો
 જીવનાર્થમહં યત્ સ્વકીયપિશિતં દાસ્યામિ તદેવ મયા વિતરિતં ભક્ષ્યમ્ |
 (aiōn g165) 52 તસ્માદ્ ચિહ્નૈયાઃ પરસ્પરં વિવદમાના વક્તુમારેભિરે એષ
 ભોજનાર્થં સ્વીયં પલલં કથમ્ અસ્મભ્યં દાસ્યતિ? 53 તદા યીશુસ્તાન્
 આવોચદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ મનુષ્યપુત્રસ્યામિષે યુષ્માભિ ન્ ભુક્તે
 તસ્ય રુધિરે ય ન પીતે જીવનેન સાદ્ધ્ યુષ્માકં સમ્બન્ધો નાસ્તિ | 54
 યો મમામિષં સ્વાદતિ મમ સુધિરઞ્ચ પિવતિ સોનન્તાયુઃ પ્રાપ્નોતિ તતઃ
 શેષેડક્ષિ તમહમ્ ઉત્થાપયિષ્યામિ | (aiōnios g166) 55 યતો મદીયમામિષં
 પરમં ભક્ષ્યં તથા મદીયં શોણિતં પરમં પેયં | 56 યો જનો મદીયં પલલં
 સ્વાદતિ મદીયં રુધિરઞ્ચ પિવતિ સ મયિ વસતિ તસ્મિન્નહ્ન વસામિ | 57
 મત્પ્રેરયિત્રા જીવતા તાતેન યથાહં જીવામિ તદ્દદ્ યઃ કશ્ચિન્ મામત્તિ સોપિ
 મયા જીવિષ્યતિ | 58 યદ્ભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ તદિદં યન્માન્નાં સ્વાદિત્વા
 યુષ્માકં પિતરોડમ્રિચન્ત તાદૃશમ્ ઇદં ભક્ષ્યં ન ભવતિ ઇદં ભક્ષ્યં યો ભક્ષતિ
 સ નિત્યં જીવિષ્યતિ | (aiōn g165) 59 યદા કફ્નાહૂમ્ પુચ્ચ્યા ભજનગેહે
 ઉપાદિશત્ તદા કથા એતા અકથયત્ | 60 તદેત્યં શ્રુત્વા તસ્ય શિષ્યાણામ્
 અનેકે પરસ્પરમ્ અકથયન્ ઇદં ગાઢં વાક્યં વાક્યમીદૃશં કઃ શ્રોતું શકુયાત્?
 61 કિન્તુ યીશુઃ શિષ્યાણામ્ ઇત્યં વિવાદં સ્વચિત્તે વિજ્ઞાય કથિતવાન્ ઇદં
 વાક્યં કિં યુષ્માકં વિધ્નં જનયતિ? 62 યદિ મનુજસુતં પૂર્વવાસસ્થાનમ્
 ઉર્હૈવ્યં ગચ્છન્તં પશ્યથ તર્હિ કિં ભવિષ્યતિ? 63 આત્મૈવ જીવનદાયકઃ

વપુ નિષ્કલં યુષ્મભ્યમહં યાનિ વચાંસિ કથયામિ તાન્યાત્મા જીવનઞ્ચ |
 64 કિન્તુ યુષ્માકં મધ્યે કેચન અવિશ્વાસિનઃ સન્તિ કે કે ન વિશ્વસન્તિ કો
 વા તં પરકરેષુ સમર્પયિષ્યતિ તાન્ યીશુરાપ્રથમાદ્ વેત્તિ | 65 અપરમપિ
 કથિતવાન્ અસ્માત્ કારણાદ્ અકથયં પિતુઃ સકાશાત્ શક્તિમપ્રાપ્ય કોપિ
 મમાન્તિકમ્ આગન્તું ન શક્નોતિ | 66 તત્કાલેડનેકે શિષ્યા વ્યાઘુટ્ય તેન
 સાદ્ધ્ પુનર્નાગચ્છન્ | 67 તદા યીશુ દ્વાદશશિષ્યાન્ ઉક્તવાન્ યૂયમપિ
 કિં યાસ્યથ? 68 તતઃ શિમોન્ પિતરઃ પ્રત્યવોચત્ હે પ્રભો કસ્યાભ્યર્ણ
 ગમિષ્યામઃ? (aiōnios g166) 69 અનન્તજીવનદાયિન્યો યાઃ કથાસ્તાસ્તવૈવ |
 ભવાન્ અમરેશ્વરસ્યાભિષિક્તપુત્ર ઇતિ વિશ્વસ્ય નિશ્ચિતં જાનીમઃ | 70
 તદા યીશુરવદત્ કિમહં યુષ્માકં દ્વાદશજનાન્ મનોનીતાન્ ન કૃતવાન્? કિન્તુ
 યુષ્માકં મધ્યેપિ કશ્ચિદેકો વિઘ્નકારી વિઘ્નતે | 71 ઇમાં કથં સ શિમોનઃ પુત્રમ્
 ઇષ્કરીયોતીયં ચિહ્નમ્ ઉદ્દિશ્ય કથિતવાન્ યતો દ્વાદશાનાં મધ્યે ગણિતઃ સ
 તં પરકરેષુ સમર્પયિષ્યતિ |

7 તતઃ પરં ચિહ્નમ્ લોકાસ્તં હન્તું સમૈહન્ત તસ્માદ્ યીશુ ચિહ્નપ્રદેશે
 પર્યટિતું નેચ્છન્ ગાલીલ્ પ્રદેશે પર્યટિતું પ્રારભત | 2 કિન્તુ તસ્મિન્ સમયે
 ચિહ્નયાનાં દૂષ્યવાસનામોત્સવ ઉપસ્થિતે 3 તસ્ય ભ્રાતરસ્તમ્ અવદન્
 યાનિ કર્માણિ ત્વયા ક્રિયન્તે તાનિ યથા તવ શિષ્યાઃ પશ્યન્તિ તદર્થં ત્વમિતઃ
 સ્થાનાદ્ ચિહ્નયદેશં વ્રજ | 4 યઃ કશ્ચિત્ સ્વયં પ્રચિકાશિષતિ સ કદાપિ
 ગુપ્તં કર્મ ન કરોતિ યદીદૃશં કર્મ કરોષિ તર્હિ જગતિ નિજં પરિચાયય |
 5 યતસ્તસ્ય ભ્રાતરોપિ તં ન વિશ્વસન્તિ | 6 તદા યીશુસ્તાન્ અવોચત્
 મમ સમય ઇદાનીં નોપતિષ્ઠતિ કિન્તુ યુષ્માકં સમયઃ સતતમ્ ઉપતિષ્ઠતિ |
 7 જગતો લોકા યુષ્માન્ ઋતીયિતું ન શકુવન્તિ કિન્તુ મામેવ ઋતીયન્તે
 યતસ્તેષાં કર્માણિ દુષ્ટાનિ તત્ર સાક્ષ્યમિદમ્ અહં દદામિ | 8 અતએવ યૂયમ્
 ઉત્સવેડસ્મિન્ યાત નાહમ્ ઇદાનીમ્ અસ્મિન્નુત્સવે યામિ યતો મમ સમય
 ઇદાનીં ન સમ્પૂર્ણઃ | 9 ઇતિ વાક્યમ્ ઉક્ત્વા સ ગાલીલિ સ્થિતવાન્ 10
 કિન્તુ તસ્ય ભ્રાતૃષુ તત્ર પ્રસ્થિતેષુ સત્સુ સોડપ્રકટ ઉત્સવમ્ અગચ્છત્ | 11
 અનન્તરમ્ ઉત્સવમ્ ઉપસ્થિતા ચિહ્નયાસ્તં મૃગયિત્વાપૃચ્છન્ સ કુત્ર? 12
 તતો લોકાનાં મધ્યે તસ્મિન્ નાનાવિધા વિવાદા ભવિતુમ્ આરબ્ધવન્તઃ |
 કેચિદ્ અવોચન્ સ ઉત્તમઃ પુરુષઃ કેચિદ્ અવોચન્ ન તથા વરં લોકાનાં ભ્રમં

જનયતિ | 13 કિન્તુ ચિહ્નયાનાં ભયાત્ કોપિ તસ્ય પક્ષે સ્પષ્ટં નાકથયત્ |
 14 તતઃ પરમ્ ઉત્સવસ્ય મધ્યસમયે યીશુ મન્દિરં ગત્વા સમુપદિશતિ સ્મ |
 15 તતો ચિહ્નયા લોકા આશ્ચર્યં જ્ઞાત્વાકથયન્ એષા માનુષો નાધીત્યા કથમ્
 એતાદૃશો વિદ્વાનભૂત્? 16 તદા યીશુઃ પ્રત્યવોચદ્ ઉપદેશોયં ન મમ કિન્તુ
 યો માં પ્રેષિતવાન્ તસ્ય | 17 યો જનો નિદેશં તસ્ય ગ્રહીષ્યતિ મમોપદેશો
 મત્તો ભવતિ કિમ્ ઇશ્વરાદ્ ભવતિ સ ગનસ્તજ્ઞાતું શક્ષ્યતિ | 18 યો જનઃ
 સ્વતઃ કથયતિ સ સ્વીયં ગૌરવમ્ ઇહતે કિન્તુ યઃ પ્રેરયિતુ ગૌરવમ્ ઇહતે સ
 સત્યવાદી તસ્મિન્ કોપ્યધર્મો નાસ્તિ | 19 મૂસા યુષ્મભ્યં વ્યવસ્થાગ્રન્થં કિં
 નાદદાત્? કિન્તુ યુષ્માકં કોપિ તાં વ્યવસ્થાં ન સમાચરતિ | માં હન્તું કુતો
 યતધ્વે? 20 તદા લોકા અવદન્ ત્વં ભૂતગ્રસ્તસ્ત્વાં હન્તું કો યતતે? 21 તતો
 યીશુરવોચદ્ એકં કર્મ મયાકારિ તસ્માદ્ યૂયં સર્વ્વ મહાશ્ચર્યં મન્યધ્વે | 22
 મૂસા યુષ્મભ્યં ત્વક્ષેદવિધિં પ્રદદૌ સ મૂસાતો ન જાતઃ કિન્તુ પિતૃપુરુષેભ્યો
 જાતઃ તેન વિશ્રામવારેડપિ માનુષાણાં ત્વક્ષેદં કુરુથ | 23 અતએવ
 વિશ્રામવારે મનુષ્યાણાં ત્વક્ષેદે કૃતે યદિ મૂસાવ્યવસ્થામજ્ઞનં ન ભવતિ
 તર્હિ મયા વિશ્રામવારે માનુષઃ સમ્પૂર્ણરૂપેણ સ્વસ્થોડકારિ તત્કારણાદ્ યૂયં
 કિં મહાં કુપ્યથ? 24 સપક્ષપાતં વિચારમકૃત્વા ન્યાય્યં વિચારં કુરુત | 25
 તદા ચિરૂશાલમ્ નિવાસિનઃ કતિપયજના અકથયન્ ઇમે યં હન્તું યેષ્ટન્તે સ
 એવાયં કિં ન? 26 કિન્તુ પશ્યત નિર્ભયઃ સન્ કથાં કથયતિ તથાપિ કિમપિ
 અ વદન્ત્યેતે અયમેવાભિષિક્તો ભવતીતિ નિશ્ચિતં કિમધિપતયો જાનન્તિ?
 27 મનુજોયં કસ્માદાગમદ્ ઇતિ વયં જાનોમઃ કિન્ત્વભિષિક્ત આગતે સ
 કસ્માદાગતવાન્ ઇતિ કોપિ જ્ઞાતું ન શક્ષ્યતિ | 28 તદા યીશુ મધ્યેમન્દિરમ્
 ઉપદિશન્ ઉચ્ચૈઃકારમ્ ઉક્તવાન્ યૂયં કિં માં જાનીથ? કસ્માચ્યાગતોસ્મિ
 તદપિ કિં જાનીથ? નાહં સ્વત આગતોસ્મિ કિન્તુ યઃ સત્યવાદી સએવ માં
 પ્રેષિતવાન્ યૂયં તં ન જાનીથ | 29 તમહં જાને તેનાહં પ્રેરિત અગતોસ્મિ | 30
 તસ્માદ્ ચિહ્નયાસ્તં ધર્તુમ્ ઉદ્યતાસ્તથાપિ કોપિ તસ્ય ગાત્રે હસ્તં નાર્પયદ્
 યતો હેતોસ્તદા તસ્ય સમયો નોપતિષ્ઠતિ | 31 કિન્તુ બહવો લોકાસ્તસ્મિન્
 વિશ્વસ્ય કથિતવાન્તોડભિષિક્તપુરુષ આગત્ય માનુષસ્યાસ્ય ક્રિયાભ્યઃ
 કિમ્ અધિકા આશ્ચર્યાઃ ક્રિયાઃ કરિષ્યતિ? 32 તતઃ પરં લોકાસ્તસ્મિન્ ઇત્યં
 વિવદન્તે ફિરૂશિનઃ પ્રધાનયાજકાએતિ શ્રુતવન્તસ્તં ધૃત્વા નેતું પદાતિગણં

प्रेषयामासुः | 33 ततो यीशुरवदद् अहम् अल्पदिनानि युष्माभिः साद्धं
 स्थित्वा भत्रेरयितुः समीपं यास्यामि | 34 मां मृगयिष्यध्वे किन्तूद्देशं न
 लप्स्यध्वे रत्र स्थास्यामि तत्र यूयं गन्तुं न शक्यथ | 35 तदा यिडूटीयाः
 परस्परं वक्तुमारोभिरे अस्योद्देशं न प्राप्स्याम अतादृशं किं स्थानं यास्यति?
 भिन्नदेशे विकीर्णानां यिडूटीयानां सन्निधिम् अेष गत्वा तान् उपदेक्ष्यति
 किं? 36 नो येत् मां गवेषयिष्यथ किन्तूद्देशं न प्राप्स्यथ अेष कोदृशं वाक्यमिदं
 वदति? 37 अनन्तरम् उत्सवस्य यरभेऽहनि अर्थात् प्रधानदिने यीशुरुत्तिष्ठन्
 उच्यैः कारम् आह्वयन् उदितवान् यद्दि कश्चित् तृषार्तो भवति तर्हि ममान्तिकम्
 आगत्य पिवतु | 38 यः कश्चिन्मयि विश्वसिति धर्मग्रन्थस्य वयनानुसारेण
 तस्याभ्यन्तरतोऽमृततोयस्य स्रोतांसि निर्गमिष्यन्ति | 39 ये तस्मिन्
 विश्वसन्ति त आत्मानं प्राप्स्यन्तीत्यर्थे स एदं वाक्यं व्याहृतवान् अतत्कालं
 यावद् यीशु विभवं न प्राप्तस्तस्मात् पवित्र आत्मा नादीयत् | 40 अेतां
 वार्त्तां श्रुत्वा बहवो लोका अवदन् अयमेव निश्चितं स भविष्यद्वादी | 41
 केयिद् अकथयन् अेषअेव सोभिषिक्तः किन्तु केयिद् अवदन् सोभिषिक्तः
 किं गालील् प्रदेशे जनिष्यते? 42 सोभिषिक्तो दायूदो वंशे दायूदो जन्मस्थाने
 बैलेलेमि पत्तने जनिष्यते धर्मग्रन्थे किमित्थं लिखितं नास्ति? 43
 एत्थं तस्मिन् लोकानां भिन्नवाक्यता जाता | 44 कतिपयलोकास्तं धर्तुम्
 अैच्छन् तथापि तद्वपुषि कोपि इस्तं नार्पयत् | 45 अनन्तरं पादातिगाणे
 प्रधानयाजकानां इिइशिनोऽत्र समीपमागतवति ते तान् अपृच्छन् कुतो
 हेतोस्तं नानयत? 46 तदा पदातयः प्रत्यवदन् स मानव एव कोपि कदापि
 नोपादिशत् | 47 ततः इिइशिनः प्रावोयन् यूयमपि किमब्रामिष्ट? 48
 अधिपतीनां इिइशिनोऽत्र कोपि किं तस्मिन् व्यश्वसीत्? 49 ये शास्त्रं न
 जानन्ति त एभेऽधमलोकाअेव शापग्रस्ताः | 50 तदा निकटीमनामा तेषामेको
 यः क्षाणदायां यीशोः सन्निधिम् अगात् स उक्तवान् 51 तस्य वाक्ये न श्रुते
 कर्म्मणि य न विदिते ऽस्माकं व्यवस्था किं कअन मनुजं दोषीकरोति? 52
 ततस्ते व्याहरन् त्वमपि किं गालीलीयलोकः? विविच्य पश्य गलीलि कोपि
 भविष्यद्वादी नोत्पद्यते | 53 ततः परं सर्व्वे स्वं स्वं गृहं गताः किन्तु यीशु
 जैतुननामानं शिलोच्ययं गतवान् |

8 પ્રત્યૂષે યીશુઃ પનર્મન્દિરમ્ આગચ્છત્ 2 તતઃ સર્વેષુ લોકેષુ તસ્ય સમીપ આગતેષુ સ ઉપવિશ્ય તાન્ ઉપદેષ્ટુમ્ આરભત | 3 તદા અધ્યાપકાઃ ક્ષિરશિનઞ્ચ વ્યભિચારકર્મણિ ધૃતં સ્ત્રિયમેકામ્ આનિય સર્વેષાં મધ્યે સ્થાપયિત્વા વ્યાહરન્ 4 હે ગુરો યોષિતમ્ ઇમાં વ્યભિચારકર્મ કુર્વાણાં લોકા ધૃતવન્તઃ | 5 એતાદૃશલોકાઃ પાષાણાઘાતેન હન્તવ્યા ઇતિ વિધિર્મૂસાવ્યવસ્થાગ્રન્થે લિખિતોસ્તિ કિન્તુ ભવાન્ કિમાદિશતિ? 6 તે તમપવદિતું પરીક્ષાભિપ્રાયેણ વાક્યમિદમ્ અપૃચ્છન્ કિન્તુ સ પ્રહ્લીભૂય ભૂમાવક્ષ્યા લેખિતુમ્ આરભત | 7 તતસ્તૈઃ પુનઃ પુનઃ પૃષ્ટ ઉત્થાય કથિતવાન્ યુષ્માકં મધ્યે યો જનો નિરપરાધી સએવ પ્રથમમ્ એનાં પાષાણેનાહન્તુ | 8 પશ્ચાત્ સ પુનશ્ચ પ્રહ્લીભૂય ભૂમૌ લેખિતુમ્ આરભત | 9 તાં કથં શ્રુત્વા તે સ્વસ્વમનસિ પ્રબોધં પ્રાપ્ય જ્યેષ્ઠાનુક્રમં એકૈકશઃ સર્વે બહિરગચ્છન્ તતો યીશુરેકાકી તયક્તોભવત્ મધ્યસ્થાને દાણ્ડાયમાના સા યોષા ચ સ્થિતા | 10 તત્પશ્ચાદ્ યીશુરુત્થાય તાં વનિતાં વિના કમપ્યપરં ન વિલોક્ય પૃષ્ટવાન્ હે વામે તવાપવાદકાઃ કુત્ર? કોપિ ત્વાં કિં ન દણ્ડયતિ? 11 સાવદત્ હે મહેચ્છ કોપિ ન તદા યીશુરવોચત્ નાહમપિ દણ્ડયામિ યાહિ પુનઃ પાપં માકાર્ષીઃ | 12 તતો યીશુઃ પુનરપિ લોકેભ્ય ઇત્યં કથયિતુમ્ આરભત જગતોહં જ્યોતિઃસ્વરૂપો યઃ કશ્ચિન્ મત્પશ્ચાદ ગચ્છતિ સ તિમિરે ન ભ્રમિત્વા જીવનરૂપાં દીપ્તિં પ્રાપ્સ્યતિ | 13 તતઃ ક્ષિરશિનોડવાદિષુસ્ત્વં સ્વાર્થે સ્વયં સાક્ષ્યં દદાસિ તસ્માત્ તવ સાક્ષ્યં ગ્રાહ્યં ન ભવતિ | 14 તદા યીશુઃ પ્રત્યુદ્ધિતવાન્ યદપિ સ્વાર્થેડહં સ્વયં સાક્ષ્યં દદામિ તથાપિ મત્ સાક્ષ્યં ગ્રાહ્યં યસ્માદ્ અહં કુત આગતોસ્મિ ક્વ યામિ ચ તદહં જાનામિ કિન્તુ કુત આગતોસ્મિ કુત્ર ગચ્છામિ ચ તદ્ યૂયં ન જાનીથ | 15 યૂયં લૌકિકં વિચારયથ નાહં કિમપિ વિચારયામિ | 16 કિન્તુ યદિ વિચારયામિ તર્હિ મમ વિચારો ગ્રહીતવ્યો યતોહમ્ એકાકી નાસ્મિ પ્રેરયિતા પિતા મયા સહ વિધતે | 17 દ્વયો જ્ઞાનયોઃ સાક્ષ્યં ગ્રહણીયં ભવતીતિ યુષ્માકં વ્યવસ્થાગ્રન્થે લિખિતમસ્તિ | 18 અહં સ્વાર્થે સ્વયં સાક્ષિત્વં દદામિ ચશ્ચ મમ તાતો માં પ્રેરિતવાન્ સોપિ મદર્થે સાક્ષ્યં દદાતિ | 19 તદા તેડપૃચ્છન્ તવ તાતઃ કુત્ર? તતો યીશુઃ પ્રત્યવાદીદ્ યૂયં માં ન જાનીથ મત્પિતરઞ્ચ ન જાનીથ યદિ મામ્ અક્ષાસ્યત તર્હિ મમ તાતમપ્યક્ષાસ્યત | 20 યીશુ મન્દિર ઉપદિશ્ય

ભાણગારે કથા એતા અકથયત્ તથાપિ તં પ્રતિ કોપિ કરં નોદતોલયત્ | 21
તતઃ પરં ચીશુઃ પુનરુદિતવાન્ અધુનાહં ગચ્છામિ યૂયં માં ગવેષયિષ્યથ
કિન્તુ નિજૈઃ પાપૈર્મરિષ્યથ યત્ સ્થાનમ્ અહં યાસ્યામિ તત્ સ્થાનમ્
યૂયં યાતું ન શક્સ્યથ | 22 તદા ચિહ્નુદીયાઃ પ્રાવોચન્ કિમયમ્ આત્મઘાતં
કરિષ્યતિ? યતો યત્ સ્થાનમ્ અહં યાસ્યામિ તત્ સ્થાનમ્ યૂયં યાતું ન
શક્સ્યથ ઇતિ વાક્યં બ્રવીતિ | 23 તતો ચીશુસ્તેભ્યઃ કથિતવાન્ યૂયમ્
અઘઃસ્થાનીયા લોકા અહમ્ ઊર્દ્ધ્વસ્થાનીયઃ યૂયમ્ એતજ્જગત્સમ્બન્ધીયા
અહમ્ એતજ્જગત્સમ્બન્ધીયો ન | 24 તસ્માત્ કથિતવાન્ યૂયં નિજૈઃ
પાપૈર્મરિષ્યથ યતોહં સ પુમાન્ ઇતિ યદિ ન વિશ્વસિથ તર્હિ નિજૈઃ પાપૈ
ર્મરિષ્યથ | 25 તદા તે ડપૃચ્છન્ કસ્ત્વં? તતો ચીશુઃ કથિતવાન્ યુષ્માકં
સન્નિઘૌ યસ્ય પ્રસ્તાવમ્ આ પ્રથમાત્ કરોમિ સએવ પુરુષોહં | 26 યુષ્માસુ
મયા બહુવાક્યં વક્તવ્યં વિચારયિતવ્યઞ્ચ કિન્તુ મત્પ્રેરયિતા સત્યવાદી
તસ્ય સમીપે યદહં શ્રુતવાન્ તદેવ જગતે કથયામિ | 27 કિન્તુ સ જનકે
વાક્યમિદં પ્રોકતવાન્ ઇતિ તે નાબુધ્યન્ત | 28 તતો ચીશુરકથયદ્ યદા
મનુષ્યપુત્રમ્ ઊર્દ્ધ્વ ઉત્થાપયિષ્યથ તદાહં સ પુમાન્ કેવલઃ સ્વયં કિમપિ
કર્મ્મ ન કરોમિ કિન્તુ તાતો યથા શિક્ષયતિ તદનુસારેણ વાક્યમિદં વદામીતિ
ય યૂયં જ્ઞાતું શક્સ્યથ | 29 મત્પ્રેરયિતા પિતા મામ્ એકાકિનં ન ત્યજતિ સ
મયા સાદ્ધર્મ્મં તિષ્ઠતિ યતોહં તદભિમતં કર્મ્મ સદા કરોમિ | 30 તદા તસ્યૈતાનિ
વાક્યાનિ શ્રુત્વા બહુવસ્તાસ્મિન્ વ્યશ્વસન્ | 31 યે ચિહ્નુદીયા વ્યશ્વસન્
ચીશુસ્તેભ્યોડકથયત્ 32 મમ વાક્યે યદિ યૂયમ્ આસ્થાં કુરુથ તર્હિ મમ
શિષ્યા ભૂત્વા સત્યત્વં જ્ઞાસ્યથ તતઃ સત્યતયા યુષ્માકં મોક્ષો ભવિષ્યતિ |
33 તદા તે પ્રત્યવાદિષુઃ વયમ્ ઇબ્રાહીમો વંશઃ કદાપિ કસ્યાપિ દાસા ન
જાતાસ્તર્હિ યુષ્માકં મુક્તિ ભવિષ્યતીતિ વાક્યં કથં બ્રવીષિ? 34 તદા
ચીશુઃ પ્રત્યવદદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ યઃ પાપં કરોતિ સ પાપસ્ય
દાસઃ | 35 દાસઞ્ચ નિરન્તરં નિવેશને ન તિષ્ઠતિ કિન્તુ પુત્રો નિરન્તરં તિષ્ઠતિ |
(aīōn g165) 36 અતઃ પુત્રો યદિ યુષ્માન્ મોચયતિ તર્હિ નિતાન્તમેવ મુક્તા
ભવિષ્યથ | 37 યુયમ્ ઇબ્રાહીમો વંશ ઇત્યહં જાનામિ કિન્તુ મમ કથા
યુષ્માકમ્ અન્તઃકરણેષુ સ્થાનં ન પ્રાપ્નુવન્તિ તસ્માદ્દેતો મ્માં હન્તુમ્ ઇહધ્વે |
38 અહં સ્વપિતુઃ સમીપે યદપશ્યં તદેવ કથયામિ તથા યૂયમપિ સ્વપિતુઃ

સમીપે યદપશ્યત તદેવ કુરુધ્વે | 39 તદા તે પ્રત્યવોચન્ ઇબ્રાહીમ્ અસ્માકં
 પિતા તતો યીશુરકથયદ્ યદિ યૂચમ્ ઇબ્રાહીમઃ સન્તાના અભવિષ્યત તર્હિ
 ઇબ્રાહીમ આચારણવદ્ આચરિષ્યત | 40 ઇશ્વરસ્ય મુખાત્ સત્યં વાક્યં
 શ્રુત્વા યુષ્માન્ જ્ઞાપયામિ યોહં તં માં હન્તું ચેષ્ઠધ્વે ઇબ્રાહીમ્ એતાદૃશં
 કર્મ્ ન ચકાર | 41 યૂયં સ્વસ્વપિતુઃ કર્મ્માણિ કુરુથ તદા તૈરુક્તં ન વયં
 જારજાતા અસ્માકમ્ એકએવ પિતાસ્તિ સ એવેશ્વરઃ 42 તતો યીશુના
 કથિતમ્ ઇશ્વરો યદિ યુષ્માકં તાતોભવિષ્યત્ તર્હિ યૂયં મયિ પ્રેમાકરિષ્યત
 યતોહમ્ ઇશ્વરાન્નિર્ગત્યાગતોસ્મિ સ્વતો નાગતોહં સ માં પ્રાહિણોત્ | 43
 યૂયં મમ વાક્યમિદં ન બુધ્યધ્વે કુતઃ? યતો યૂયં મમોપદેશં સોહું ન શક્નુથ |
 44 યૂયં શૈતાન્ પિતુઃ સન્તાના એતસ્માદ્ યુષ્માકં પિતુરભિલાષં પૂરયથ સ
 આ પ્રથમાત્ નરઘાતી તદન્તઃ સત્યત્વસ્ય લેશોપિ નાસ્તિ કારણાદતઃ સ
 સત્યતાયાં નાતિષ્ઠત્ સ યદા મૃષા કથયતિ તદા નિજસ્વભાવાનુસારેણૈવ
 કથયતિ યતો સ મૃષાભાષી મૃષોત્યાદકશ્ચ | 45 અહં તથ્યવાક્યં વદામિ
 કારણાદસ્માદ્ યૂયં માં ન પ્રતીથ | 46 મયિ પાપમસ્તીતિ પ્રમાણં યુષ્માકં
 કો દાતું શક્નોતિ? યદહં તથ્યવાક્યં વદામિ તર્હિ કુતો માં ન પ્રતિથ?
 47 યઃ કશ્ચન ઇશ્વરીયો લોકઃ સ ઇશ્વરીયકથાયાં મનો નિધત્તે યૂચમ્
 ઇશ્વરીયલોકા ન ભવથ તન્નિદાનાત્ તત્ર ન મનાંસિ નિધદ્વે | 48 તદા
 યિહૂદીયાઃ પ્રત્યવાદિષુઃ ત્વમેકઃ શોમિરોણીયો ભૂતગ્રસ્તશ્ચ વયં કિમિદં ભદ્રં
 નાવાદિષ્મ? 49 તતો યીશુઃ પ્રત્યવાદીત્ નાહં ભૂતગ્રસ્તઃ કિન્તુ નિજતાતં
 સમ્મન્યે તસ્માદ્ યૂયં મામ્ અપમન્યધ્વે | 50 અહં સ્વસુખ્યાતિં ન ચેષ્ટે
 કિન્તુ ચેષ્ટિતા વિચારયિતા યાપર એક આસ્તે | 51 અહં યુષ્મભ્યમ્ અતીવ
 યથાર્થં કથયામિ યો નરો મદીયં વાયં મન્યતે સ કદાચન નિધનં ન દ્રક્ષ્યતિ |
 (aiōn g165) 52 યિહૂદીયાસ્તમવદન્ ત્વં ભૂતગ્રસ્ત ઇતીદાનીમ્ અવૈષ્મ |
 ઇબ્રાહીમ્ ભવિષ્યદ્વાદિનઞ્ચ સર્વે મૃતાઃ કિન્તુ ત્વં ભાષસે યો નરો મમ
 ભારતીં ગૃહ્ણાતિ સ જાતુ નિધાનાસ્વાદં ન લપ્સ્યતે | (aiōn g165) 53 તર્હિ
 ત્વં કિમ્ અસ્માકં પૂર્વપુરુષાદ્ ઇબ્રાહીમોપિ મહાન? યસ્માત્ સોપિ મૃતઃ
 ભવિષ્યદ્વાદિનોપિ મૃતાઃ ત્વં સ્વં કં પુમાંસં મનુષે? 54 યીશુઃ પ્રત્યવોચદ્
 યદહં સ્વં સ્વયં સમ્મન્યે તર્હિ મમ તત્ સમ્મનનં કિમપિ ન કિન્તુ મમ તાતો યં
 યૂયં સ્વીયમ્ ઇશ્વરં ભાષધ્વે સએવ માં સમ્મનુતે | 55 યૂયં તં નાવગચ્છથ

કિન્ત્વહં તમવગચ્છામિ તં નાવગચ્છામીતિ વાક્યં યદિ વદામિ તર્હિં યૂયમિવ
 મૃષાભાષી ભવામિ કિન્ત્વહં તમવગચ્છામિ તદાક્ષામપિ ગૃહ્ણામિ | 56 યુષ્માકં
 પૂર્વપુરુષ ઇબ્રાહીમ્ મમ સમયં દ્રુષ્ટુમ્ અતીવાવાઞ્છત્ તન્નિરીક્ષ્યાનન્દચ્ચ |
 57 તદા ચિહ્લૂદીયા અપૃચ્છન્ તવ વયઃ પઞ્ચાશદ્વત્સરા ન ત્વં કિમ્ ઇબ્રાહીમમ્
 અદ્રાક્ષીઃ? 58 યીશુઃ પ્રત્યવાદીદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ ઇબ્રાહીમો
 જન્મનઃ પૂર્વકાલમારભ્યાહં વિધે | 59 તદા તે પાષાણાન્ ઉત્તોલ્ય તમાહન્તુમ્
 ઉદયચ્છન્ કિન્તુ યીશુ ગુપ્તો મન્તિરાદ્ બહિર્ગત્ય તેષાં મધ્યેન પ્રસ્થિતવાન્ |

9 તતઃ પરં યીશુર્ગચ્છન્ માર્ગમધ્યે જન્માન્ધં નરમ્ અપશ્યત્ | 2
 તતઃ શિષ્યાસ્તમ્ અપૃચ્છન્ હે ગુરો નરોયં સ્વપાપેન વા સ્વપિત્રાઃ
 પાપેનાન્ધોઽજાયત? 3 તતઃ સ પ્રત્યુદિતવાન્ એતસ્ય વાસ્ય પિત્રોઃ પાપાદ્
 એતાદૃશોભૂદ ઇતિ નહિ કિન્ત્વનેન યથેશ્વરસ્ય કર્મ પ્રકાશ્યતે તદ્દેતોરેવ |
 4 દિને તિષ્ઠતિ મત્તેરયિતુઃ કર્મ મયા કર્તવ્યં યદા કિમપિ કર્મ ન ક્રિયતે
 તાદૃશી નિશાગચ્છતિ | 5 અહં યાવત્કાલં જગતિ તિષ્ઠામિ તાવત્કાલં જગતો
 જ્યોતિઃસ્વરૂપોસ્મિ | 6 ઇત્યુક્ત્તા ભૂમૌ નિષ્ઠીવં નિક્ષિપ્ય તેન પદ્મં કૃતવાન્ 7
 પશ્ચાત્ તત્પદ્મન તસ્યાન્ધસ્ય નેત્રે પ્રલિપ્ય તમિત્યાદિશત્ ગત્વા શિલોહે
 ડર્થાત્ પ્રેરિતનામ્નિ સરસિ સ્નાહિ | તતોન્ધો ગત્વા તત્રાસ્નાત્ તતઃ પ્રન્નચક્ષુ
 ભૂત્વા વ્યાઘુટ્યાગાત્ | 8 અપરઞ્ચ સમીપવાસિનો લોકા યે ય તં પૂર્વમન્ધમ્
 અપશ્યન્ તે બક્તુમ્ આરભન્ત યોન્ધલોકો વર્ત્મન્યુપવિશ્યાભિક્ષત સ
 એવાયં જનઃ કિં ન ભવતિ? 9 કેચિદવદન્ સ એવ કેચિદવોચન્ તાદૃશો
 ભવતિ કિન્તુ સ સ્વયમબ્રવીત્ સ એવાહં ભવામિ | 10 અતએવ તે ડપૃચ્છન્
 ત્વં કથં દૃષ્ટિં પાપ્તવાન્? 11 તતઃ સોવદદ્ યીશનામક એકો જનો મમ નયને
 પદ્મન પ્રલિપ્ય ઇત્યાજ્ઞાપયત્ શિલોહકાસારં ગત્વા તત્ર સ્નાહિ | તતસ્તત્ર
 ગત્વા મયિ સ્નાતે દૃષ્ટિમહં લબ્ધવાન્ | 12 તદા તે ડવદન્ સ પુમાન્ કુત્ર?
 તેનોક્તં નાહં જાનામિ | 13 અપરં તસ્મિન્ પૂર્વાન્ધે જને ક્ષિરશિનાં નિકટમ્
 આનીતે સતિ ક્ષિરશિનોપિ તમપૃચ્છન્ કથં દૃષ્ટિં પ્રાપ્તોસિ? 14 તતઃ સ
 કથિતવાન્ સ પદ્મન મમ નેત્રે ડલિમ્પત્ પશ્ચાદ્ સ્નાત્વા દૃષ્ટિમલભે | 15
 કિન્તુ યીશુ વિશ્રામવારે કર્દમં કૃત્વા તસ્ય નયને પ્રસન્નેઽકરોદ્ ઇતિકારણાત્
 કતિપચક્ષિરશિનોડવદન્ 16 સ પુમાન્ ઇશ્વરાન્ન યતઃ સ વિશ્રામવારં ન
 મન્યતે | તતોન્ધે કેચિત્ પ્રત્યવદન્ પાપી પુમાન્ કિમ્ એતાદૃશમ્ આશ્ચર્યં

કર્મ કર્તુ શકનોતિ? 17 ઇત્યં તેષાં પરસ્પરં ભિન્નવાક્યત્વમ્ અભવત્ |
 પશ્ચાત્ તે પુનરપિ તં પૂર્વાન્ધં માનુષમ્ અપ્રાક્ષુઃ યો જનસ્તવ ચક્ષુષી પ્રસન્ને
 કૃતવાન્ તસ્મિન્ ત્વં કિં વદસિ? સ ઉક્તવાન્ સ ભવિશદ્વાદી | 18 સ દૃષ્ટિમ્
 આપ્તવાન્ ઇતિ ચિહ્નૈયાસ્તસ્ય દૃષ્ટિં પ્રાપ્તસ્ય જનસ્ય પિત્રો મુખ્યાદ્ અશ્રુત્વા
 ન પ્રત્યયન્ | 19 અતએવ તે તાવપૃચ્છન્ યુવયો ર્યં પુત્રં જન્માન્ધં વદથઃ સ
 કિમયં? તર્હીદાનીં કથં દ્રષ્ટું શકનોતિ? 20 તતસ્તસ્ય પિતરૌ પ્રત્યવોચતામ્
 અયમ્ આવયોઃ પુત્ર આ જનેરન્ધશ્ચ તદધ્યાવાં જાનીવઃ 21 કિન્ત્વધુના કથં
 દૃષ્ટિં પ્રાપ્તવાન્ તદાવાં ન્ જાનીવઃ કોસ્ય ચક્ષુષી પ્રસન્ને કૃતવાન્ તદપિ ન
 જાનીવ એષ વયઃપ્રાપ્ત એનં પૃચ્છત સ્વકથાં સ્વયં વક્ષ્યતિ | 22 ચિહ્નૈયાનાં
 ભયાત્ તસ્ય પિતરૌ વાક્યમિદમ્ અવદતાં યતઃ કોપિ મનુષ્યો યદિ યીશુમ્
 અભિષિક્તં વદતિ તર્હિ સ ભજનગૃહાદ્ દૂરીકારિષ્યતે ચિહ્નૈયા ઇતિ
 મન્ત્રણામ્ અકુર્વન્ 23 અતસ્તસ્ય પિતરૌ વ્યાહરતામ્ એષ વયઃપ્રાપ્ત એનં
 પૃચ્છત | 24 તદા તે પુનશ્ચ તં પૂર્વાન્ધમ્ આહૂય વ્યાહરન્ ઈશ્વરસ્ય ગુણાન્
 વદ એષ મનુષ્યઃ પાપીતિ વયં જાનીમઃ | 25 તદા સ ઉક્તવાન્ સ પાપી ન
 વેતિ નાહં જાને પૂર્વામન્ધ આસમહમ્ અધુના પશ્યામીતિ માત્રં જાનામિ | 26
 તે પુનરપૃચ્છન્ સ ત્વાં પ્રતિ કિમકરોત્? કથં નેત્રે પ્રસન્ને ડકરોત્? 27 તતઃ
 સોવાદીદ્ એકકૃત્વોકથયં યૂયં ન શૃણુથ તર્હિ કુતઃ પુનઃ શ્રોતુમ્ ઇચ્છથ?
 યૂયમપિ કિં તસ્ય શિષ્યા ભવિતુમ્ ઇચ્છથ? 28 તદા તે તં તિરસ્કૃત્ય
 વ્યાહરન્ ત્વં તસ્ય શિષ્યો વયં મૂસાઃ શિષ્યાઃ | 29 મૂસાવક્ત્રોણેશ્વરો
 જગાદ તજજાનીમઃ કિન્ત્વેષ કુત્રત્યલોક ઇતિ ન જાનીમઃ | 30 સોવદદ્
 એષ મમ લોચને પ્રસન્ને ડકરોત્ તથાપિ કુત્રત્યલોક ઇતિ યૂયં ન જાનીથ
 એતદ્ આશ્ચર્ય્યં ભવતિ | 31 ઈશ્વરઃ પાપિનાં કથાં ન શૃણોતિ કિન્તુ યો
 જનસ્તસ્મિન્ ભક્તિં કૃત્વા તદિષ્ટક્રિયાં કરોતિ તસ્યૈવ કથાં શૃણોતિ એતદ્
 વયં જાનીમઃ | 32 કોપિ મનુષ્યો જન્માન્ધાય ચક્ષુષી અદદાત્ જગદારમ્ભાદ્
 એતાદૃશીં કથાં કોપિ કદાપિ નાશૃણોત્ | (aiōn g165) 33 અસ્માદ્ એષ
 મનુષ્યો યદીશ્વરાન્નાજાયત તર્હિ કિન્નિદપીદૃશં કર્મ કર્તુ નાશકનોત્ | 34
 તે વ્યાહરન્ ત્વં પાપાદ્ અજાયથાઃ કિમસ્માન્ ત્વં શિક્ષયસિ? પશ્ચાત્ તે તં
 બહિરકુર્વન્ | 35 તદનન્તરં ચિહ્નૈયૈઃ સ બહિરક્રિયત યીશુરિતિ વાર્તા
 શ્રુત્વા તં સાક્ષાત્ પ્રાપ્ય પૃષ્ટવાન્ ઈશ્વરસ્ય પુત્રે ત્વં વિશ્વસિષિ? 36 તદા સ

પ્રત્યવોચત્ હે પ્રભો સ કો યત્ તસ્મિન્નહં વિશ્વસિમિ? 37 તતો યીશુઃ
કથિતવાન્ ત્વં તં દૃષ્ટવાન્ ત્વયા સાકં યઃ કથં કથયતિ સએવ સઃ | 38 તદા
હે પ્રભો વિશ્વસિમીત્યુક્ત્વા સ તં પ્રણામત્ | 39 પશ્ચાદ્ યીશુઃ કથિતવાન્
નયનહીના નયનાનિ પ્રાપ્નુવન્તિ નયનવન્તશ્ચાન્ધા ભવન્તીત્યભિપ્રાયેણ
જગદાહમ્ આગચ્છમ્ | 40 એતત્ શ્રુત્વા નિકટસ્થાઃ કતિપયાઃ ક્ષિરુશિનો
વ્યાહરન્ વયમપિ કિમન્ધાઃ? 41 તદા યીશુરવાદીદ્ યધન્ધા અભવત તર્હિ
પાપાનિ નાતિષ્ઠન્ કિન્તુ પશ્યામીતિ વાક્યવદનાદ્ યુષ્માકં પાપાનિ તિષ્ઠન્તિ |

10 અહં યુષ્માનતિયથાર્થં વદામિ, યો જનો દ્વારેણ ન પ્રવિશ્ય કેનાપ્યન્યેન
મેષગૃહં પ્રવિશતિ સ એવ સ્તેનો દસ્યુશ્ચ | 2 યો દ્વારેણ પ્રવિશતિ સ એવ
મેષપાલકઃ | 3 દૌવારિકસ્તસ્મૈ દ્વારં મોચયતિ મેષગણશ્ચ તસ્ય વાક્યં
શૃણોતિ સ નિજાન્ મેષાન્ સ્વસ્વનામ્નાહૂય બહિઃ કૃત્વા નયતિ | 4 તથા
નિજાન્ મેષાન્ બહિઃ કૃત્વા સ્વયં તેષામ્ અગ્રે ગચ્છતિ, તતો મેષાસ્તસ્ય
શબ્દં બુદ્ધ્યન્તે, તસ્માત્ તસ્ય પશ્ચાદ્ વ્રજન્તિ | 5 કિન્તુ પરસ્ય શબ્દં ન
બુદ્ધ્યન્તે તસ્માત્ તસ્ય પશ્ચાદ્ વ્રજિષ્યન્તિ વરં તસ્ય સમીપાત્ પલાયિષ્યન્તે |
6 યીશુસ્તેભ્ય ઇમાં દૃષ્ટાન્તકથામ્ અકથયત્ કિન્તુ તેન કથિતકથાયાસ્તાત્પર્યં
તે નાબુદ્ધ્યન્ત | 7 અતો યીશુઃ પુનરકથયત્, યુષ્માનાહં યથાર્થતરં વ્યાહરામિ,
મેષગૃહસ્ય દ્વારમ્ અહમેવ | 8 મયા ન પ્રવિશ્ય ય આગચ્છન્ તે સ્તેના
દસ્યવશ્ચ કિન્તુ મેષાસ્તેષાં કથા નાશૃણવન્ | 9 અહમેવ દ્વારસ્વરૂપઃ, મયા
યઃ કશ્ચિત પ્રવિશતિ સ રક્ષાં પ્રાપ્સ્યતિ તથા બહિરન્તશ્ચ ગમનાગમને કૃત્વા
ચરણસ્થાનં પ્રાપ્સ્યતિ | 10 યો જનસ્તેનઃ સ કેવલં સ્તૈન્યબધવિનાશાન્
કર્તુમેવ સમાયાતિ કિન્ત્વહમ્ આયુ દર્શતુમ્ અર્થાત્ બાહૂલ્યેન તદેવ દાતુમ્
આગચ્છમ્ | 11 અહમેવ સત્યમેષપાલકો યસ્તુ સત્યો મેષપાલકઃ સ મેષાર્થં
પ્રાણત્યાગં કરોતિ; 12 કિન્તુ યો જનો મેષપાલકો ન, અર્થાદ્ યસ્ય મેષા નિજા
ન ભવન્તિ, ય એતાદૃશો વૈતનિકઃ સ વૃકમ્ આગચ્છન્તં દૃષ્ટ્વા મેજવ્રજં વિહાય
પલાયતે, તસ્માદ્ વૃકસ્તં વ્રજં ધૃત્વા વિકિરતિ | 13 વૈતનિકઃ પલાયતે યતઃ સ
વેતનાર્થો મેષાર્થં ન ચિન્તયતિ | 14 અહમેવ સત્યો મેષપાલકઃ, પિતા માં યથા
જાનાતિ, અહન્ન યથા પિતરં જાનામિ, 15 તથા નિજાન્ મેષાનપિ જાનામિ,
મેષાશ્ચ માં જાનાન્તિ, અહન્ન મેષાર્થં પ્રાણત્યાગં કરોમિ | 16 અપરન્ન એતદ્
ગૃહીય મેષેભ્યો ભિન્ના અપિ મેષા મમ સન્તિ તે સકલા આનયિતવ્યાઃ; તે

मम शब्दं श्रोष्यन्ति तत अेको व्रज अेको रक्षको भविष्यति | 17 प्राणानहं
 त्यक्त्वा पुनः प्राणान् ग्रहीष्यामि, तस्मात् पिता मयि स्नेहं करोति | 18
 कश्चिज्जानो मम प्राणान् हन्तुं न शक्नोति किन्तु स्वयं तान् समर्पयामि
 तान् समर्पयितुं पुनर्गृहीतुञ्च मम शक्तिरास्ते भारमिमं स्वपितुः सकाशात्
 प्राप्तोऽहम् | 19 अस्माद्गुपदेशात् पुनश्च यिद्धूदीयानां मध्ये भिन्नवाक्यता
 जाता | 20 ततो बहवो व्याहरन् अेष भूतग्रस्त उन्मत्तश्च, कुत अेतस्य कथां
 शृणुथ? 21 केचिद् अवदन् अेतस्य कथा भूतग्रस्तस्य कथावन्न भवन्ति,
 भूतः किम् अन्धाय यक्षुषी दातुं शक्नोति? 22 शीतकाले यिद्धूदीयानि
 मन्दिरोत्सर्गपर्व्वार्युपस्थिते 23 यीशुः सुलेमानो निःसारोऽगमनागमने
 करोति, 24 अेतस्मिन् समये यिद्धूदीयास्तं वेष्टयित्वा व्याहरन् कति कालान्
 अस्माकं विचिकित्सां स्थापयिष्यामि? यद्यन्निषिक्तो भवति तर्हि तत् स्पष्टं
 वद | 25 तदा यीशुः प्रत्यवदद् अहम् अयकथं किन्तु यूयं न प्रतीथ, निजपितु
 नान्ना यां यां क्रियां करोमि सा क्रियैव मम साक्षिस्वरूपा | 26 किन्त्वहं
 पूर्व्वमकथयं यूयं मम भेषा न भवथ, कारण्वादस्मान् न विश्वसिथ | 27 मम
 भेषा मम शब्दं शृण्वन्ति तानहं जानामि ते य मम पश्चाद् गच्छन्ति |
 28 अहं तेभ्योऽनन्तायु र्ददामि, ते कदापि न नश्यन्ति कोपि मम करात्
 तान् हर्तुं न शक्यति | (aiōn g165, aiōnios g166) 29 यो मम पिता तान्
 मह्यं दत्तवान् स सर्व्वस्मात् महान्, कोपि मम पितुः करात् तान् हर्तुं न
 शक्यति | 30 अहं पिता य द्वयोरेकत्वम् | 31 ततो यिद्धूदीयाः पुनरपि
 तं हन्तुं पाषाणान् उदतोलयन् | 32 यीशुः कथितवान् पितुः सकाशाद्
 बहून्युत्तमकर्म्मणि युष्माकं प्राकाशयं तेषां कस्य कर्म्मणः कारणान् मां
 पाषाणैराहन्तुम् उधताः स्थ? 33 यिद्धूदीयाः प्रत्यवदन् प्रशस्तकर्म्महेतो
 र्न् किन्तु त्वं मानुषः स्वमीश्वरम् उक्त्वेश्वरं निन्दसि कारण्वादस्मात् त्वां
 पाषाणैर्हन्मः | 34 तदा यीशुः प्रत्युक्तवान् मया कथितं यूयम् ईश्वरा
 अेतद्वयनं युष्माकं शास्त्रे लिखितं नास्ति किं? 35 तस्माद् येषाम् उद्देशे
 ईश्वरस्य कथा कथिता ते यदीश्वरगणा उच्यन्ते धर्म्मग्रन्थस्याप्यन्यथा
 भवितुं न शक्यं, 36 तर्ह्याहम् ईश्वरस्य पुत्र इति वाक्यस्य कथनात् यूयं
 पित्रान्निषिक्तं जगति प्रेरितञ्च पुमांसं कथम् ईश्वरनिन्दकं वादय? 37 यद्यहं
 पितुः कर्म्म न करोमि तर्हि मां न प्रतीत; 38 किन्तु यदि करोमि तर्हि मयि

યુષ્માભિઃ પ્રત્યયે ન કૃતેડપિ કાર્યે પ્રત્યયઃ ક્રિયતાં, તતો મયિ પિતાસ્તીતિ
 પિતર્યહમ્ અસ્મીતિ ચ ક્ષાત્વા વિશ્વસિષ્યથ | 39 તદા તે પુનરપિ તં ધર્તુમ્
 અયેષ્ટન્ત કિન્તુ સ તેષાં કરેભ્યો નિસ્તીર્ય 40 પુન ર્યદ્ન અધાસ્તટે યત્ર પુર્વ્ય
 યોહન્ અમજ્જયત્ તત્રાગત્ય ન્યવસત્ | 41 તતો બહવો લોકાસ્તસમીપમ્
 આગત્ય વ્યાહરન્ યોહન્ કિમપ્યાશ્રય્ય કર્મ્મ નાકરોત્ કિન્ત્વસ્મિન્ મનુષ્યે
 યા યઃ કથા અકથયત્ તાઃ સર્વાઃ સત્યાઃ; 42 તત્ર ચ બહવો લોકાસ્તસ્મિન્
 વ્યશ્વસન્ |

11 અનન્તરં મરિયમ્ તસ્યા ભગિની મર્થા ચ યસ્મિન્ વૈથનીયાગ્રામે
 વસતસ્તસ્મિન્ ગ્રામે ઇલિયાસર્ નામા પીડિત એક આસીત્ | 2 યા મરિયમ્
 પ્રભુ સુગન્ધિતેલૈન મર્દયિત્વા સ્વકેશૈસ્તસ્ય ચરાણૌ સમમાર્જત્ તસ્યા ભ્રાતા
 સ ઇલિયાસર્ રોગી | 3 અપરઞ્ચ હે પ્રભો ભવાન્ યસ્મિન્ પ્રીયતે સ
 એવ પીડિતોસ્તીતિ કથાં કથયિત્વા તસ્ય ભગિન્યૌ પ્રેષિતવત્યૌ | 4 તદા
 યીશુરિમાં વાર્તા શ્રુત્વાકથયત પીડેયં મરણાર્થં ન કિન્ત્વીશ્વરસ્ય મહિમાર્થમ્
 ઇશ્વરપુત્રસ્ય મહિમપ્રકાશાર્થઞ્ચ જાતા | 5 યીશુ ર્યધપિમર્થાયાં તદ્ભગિન્યામ્
 ઇલિયાસરિ ચાપ્રીયત, 6 તથાપિ ઇલિયાસરઃ પીડાયાઃ કથં શ્રુત્વા યત્ર
 આસીત્ તત્રૈવ દિનદ્વયમતિષ્ઠત્ | 7 તતઃ પરમ્ સ શિષ્યાનકથયદ્ વયં પુન
 ર્યિહૂદીયપ્રદેશં યામઃ | 8 તતસ્તે પ્રત્યવદન્ હે ગુરો સ્વલ્પદિનાનિ ગતાનિ
 ચિહૂદીયાસ્ત્વાં પાષાણૌ હન્તુમ્ ઉધતાસ્તથાપિ કિં પુનસ્તત્ર યાસ્યસિ?
 9 યીશુઃ પ્રત્યવદત્, એકસ્મિન્ દિને કિં દ્વાદશઘટિકા ન ભવન્તિ? કોપિ
 દિવા ગચ્છન્ ન સ્ખલતિ યતઃ સ એતજ્જગતો દીપ્તિં પ્રાપ્નોતિ | 10
 કિન્તુ રાત્રૌ ગચ્છન્ સ્ખલતિ યતો હેતોસ્તત્ર દીપ્તિ નીસ્તિ | 11 ઇમાં કથાં
 કથયિત્વા સ તાનવદદ્, અસ્માકં બન્ધુઃ ઇલિયાસર્ નિદ્રિતોભૂદ્ ઇદાનીં
 તં નિદ્રાતો જાગરયિતું ગચ્છામિ | 12 યીશુ મૃતૌ કથામિમાં કથિતવાન્
 કિન્તુ વિશ્રામાર્થં નિદ્રાયાં કથિતવાન્ ઇતિ જ્ઞાત્વા શિષ્યા અકથયન્, 13 હે
 ગુરો સ યદિ નિદ્રાતિ તર્હિ ભદ્રમેવ | 14 તદા યીશુઃ સ્પષ્ટં તાન્ વ્યાહરત્,
 ઇલિયાસર્ અમ્રિયત; 15 કિન્તુ યૂયં યથા પ્રતીથ તદર્થમહં તત્ર ન સ્થિતવાન્
 ઇત્યસ્માદ્ યુષ્મન્નિમિત્તમ્ આહ્લાદિતોહં, તથાપિ તસ્ય સમીપે યામ |
 16 તદા થોમા યં દિદુમં વદન્તિ સ સક્કિનઃ શિષ્યાન્ અવદદ્ વયમપિ
 ગત્વા તેન સાદ્ધ્ મિયામહે | 17 યીશુસ્તત્રોપસ્થાય ઇલિયાસરઃ શ્મશાને

स्थापनात् यत्वारि दिनानि गतानीति वार्ता श्रुतवान्। 18 वैथनीया
 यिःशालमः समीपस्था क्रौशैकमात्रान्तरिता; 19 तस्माद् भडवो यिडूदीया
 मर्था मरियमत्र त्वातृशोकापन्नां सान्त्वयितुं तयोः समीपम् आगच्छन्।
 20 मर्था यीशोरागमनवार्ता श्रुत्वैव तं साक्षाद् अकरोत् किन्तु मरियम्
 गेड उपविश्य स्थिता। 21 तदा मर्था यीशुमवादत्, हे प्रभो यद्वि भवान्
 अत्रास्थास्यत् तर्हि मम भ्राता नामरिष्यत्। 22 किन्त्विदानीमपि यद्
 एश्वरे प्रार्थयिष्यते एश्वरस्तद् दास्यतीति जानेऽहं। 23 यीशुरवादीत्
 तव भ्राता समुत्थास्यति। 24 मर्था व्याडरत् शेषदिवसे स उत्थानसमये
 प्रोत्थास्यतीति जानेऽहं। 25 तदा यीशुः कथितवान् अहमेव उत्थापयिता
 ञ्जययिता य यः कश्चन मयि विश्वसिति स मृत्वापि ञ्जयिष्यति; 26 यः
 कश्चन य ञ्जयन् मयि विश्वसिति स कदापि न मरिष्यति, अस्यां कथायां किं
 विश्वसिषि? (aīōn g165) 27 सावदत् प्रभो यस्यावतरणापेक्षास्ति भवान्
 सभेवाभिषिक्त एश्वरपुत्र इति विश्वसिमि। 28 इति कथां कथयित्वा
 सा गत्वा स्वां भगिनीं मरियमं गुप्तमाडूय व्याडरत् गुरुरुपतिष्ठति
 त्वामाडूयति य। 29 कथाभिमां श्रुत्वा सा तूर्णम् उत्थाय तस्य समीपम्
 अगच्छत्। 30 यीशुः ग्राममध्यं न प्रविश्य यत्र मर्था तं साक्षाद् अकरोत् तत्र
 स्थितवान्। 31 ये यिडूदीया मरियमा साकं गृहे तिष्ठन्तस्ताम् असान्त्वयन्
 ते तां क्षिप्रम् उत्थाय गच्छन्ति विलोक्य व्याडरन्, स श्मशाने रोदितुं
 याति, इत्युक्त्वा ते तस्याः पश्चाद् अगच्छन्। 32 यत्र यीशुरतिष्ठत् तत्र
 मरियम् उपस्थाय तं दृष्ट्वा तस्य यराण्योः पतित्वा व्याडरत् हे प्रभो
 यद्वि भवान् अत्रास्थास्यत् तर्हि मम भ्राता नामरिष्यत्। 33 यीशुस्तां
 तस्याः सङ्गिनो यिडूदीयांश्च रुदतो विलोक्य शोकार्तः सन् दीर्घं निश्वस्य
 कथितवान् तं कुत्रास्थापयत? 34 ते व्याडरन्, हे प्रभो भवान् आगत्य
 पश्यतु। 35 यीशुना कन्दितं। 36 अतमेव यिडूदीया अवदन्, पश्यतायं
 तस्मिन् किदृग् अप्रियत। 37 तेषां केचिद् अवदन् योन्धाय यक्षुषी दत्तवान्
 स किम् अस्य मृत्युं निवारयितुं नाशक्नोत्? 38 ततो यीशुः पुनरन्तर्दीर्घं
 निश्वस्य श्मशानान्तिकम् अगच्छत्। तत् श्मशानम् अकं गह्वरं तन्मुभे
 पाषाण अक आसीत्। 39 तदा यीशुरवदद् अनेन पाषाणम् अपसारयत,
 ततः प्रमीतस्य भगिनी मर्थावदत् प्रभो, अधुना तत्र दुर्गन्धो जातः, यतोऽध

યત્વારિ દિનાનિ શ્મશાને સ તિષ્ઠતિ | 40 તદા યીશુસ્વાદીત્, યદિ વિશ્વસિષિ
 તર્હીશ્વરસ્ય મહિમપ્રકાશં દ્રક્ષ્યસિ કથામિમાં કિં તુભ્યં નાકથયં? 41 તદા
 મૃતસ્ય શ્મશાનાત્ પાષાણોડપસારિતે યીશુર્ફલ્લવ્યં પશ્યન્ અકથયત્, હે
 પિત ભમ નેવેસનમ્ અશૃણોઃ કારણાદસ્માત્ ત્વાં ધન્યં વદામિ | 42 ત્વં
 સતતં શૃણોષિ તદધ્યહં જાનામિ, કિન્તુ ત્વં માં યત્ પ્રૈરયસ્તદ્ યથાસ્મિન્
 સ્થાને સ્થિતા લોકા વિશ્વસન્તિ તદર્થમ્ ઇદં વાક્યં વદામિ | 43 ઇમાં કથાં
 કથયિત્વા સ પ્રોચ્ચૈરાહ્યત્, હે ઇલિયાસર્ બહિરાગચ્છ | 44 તતઃ સ પ્રમીતઃ
 શ્મશાનવસ્ત્રૈર્ બદ્ધસ્તપાદો ગાત્રમાર્જનવાસસા બદ્ધમુખશ્ચ બહિરાગચ્છત્ |
 યીશુરુદ્ધિતવાન્ બન્ધનાનિ મોચયિત્વા ત્યજતૈનં | 45 મરિયમઃ સમીપમ્
 આગતા યે યિહૂદીયલોકાસ્તદા યીશોરેતત્ કર્માપશ્યન્ તેષાં બહવો
 વ્યશ્વસન્, 46 કિન્તુ કેચિદન્યે ફિરૂશિનાં સમીપં ગત્વા યીશોરેતસ્ય કર્માણો
 વાર્તામ્ અવદન્ | 47 તતઃ પરં પ્રધાનયાજકાઃ ફિરૂશિનાશ્ચ સભાં કૃત્વા
 વ્યાહરન્ વયં કિં કુર્મઃ? એષ માનવો બહૂન્યાશ્ચર્યકર્માણિ કરોતિ | 48
 યદીદૃશં કર્મ કર્તું ન વારયામસ્તર્હિ સર્વે લોકાસ્તસ્મિન્ વિશ્વસિષ્યન્તિ
 રોમિલોકાશ્ચાગત્યાસ્માકમ્ અનયા રાજધાન્યા સાદ્ધં રાજ્યમ્ આછેત્સ્યન્તિ |
 49 તદા તેષાં કિયફાનામા યસ્તસ્મિન્ વત્સરે મહાયાજકપદે ન્યયુજ્યત
 સ પ્રત્યવદદ્ યૂયં કિમપિ ન જાનીથ; 50 સમગ્રદેશસ્ય વિનાશતોપિ
 સર્વલોકાર્થમ્ એકસ્ય જનસ્ય મરણમ્ અસ્માકં મજ્જલહેતુકમ્ એતસ્ય
 વિવેચનામપિ ન કુરુથ | 51 એતાં કથાં સ નિજબુદ્ધ્યા વ્યાહરદ્ ઇતિ
 ન, 52 કિન્તુ યીશૂસ્તદેશીયાનાં કારણાત્ પ્રાણાન્ ત્યક્ષ્યતિ, દિશિ દિશિ
 વિકીર્ણાન્ ઇશ્વરસ્ય સન્તાનાન્ સંગૃહ્ણીકજાતિં કરિષ્યતિ ચ, તસ્મિન્ વત્સરે
 કિયફા મહાયાજકત્વપદે નિયુક્તઃ સન્ ઇદં ભવિષ્યદ્વાક્યં કથિતવાન્ | 53
 તદ્દિનમારભ્ય તે કથં તં હન્તું શકન્વન્તીતિ મન્ત્રાણાં કર્તું પ્રારેભિરે | 54
 અતએવ યિહૂદીયાનાં મધ્યે યીશુઃ સપ્રકાશં ગમનાગમને અકૃત્વા તસ્માદ્
 ગત્વા પ્રાન્તરસ્ય સમીપસ્થાયિપ્રદેશસ્યેફાયિમ્ નામ્નિ નગરે શિષ્યૈઃ સાકં
 કાલં યાપયિતું પ્રારેભે | 55 અનન્તરં યિહૂદીયાનાં નિસ્તારોત્સવે નિકટવર્તિનિ
 સતિ તદ્દુત્સવાત્ પૂર્વે સ્વાન્ શુચીન્ કર્તું બહવો જના ગ્રામેભ્યો યિરૂશાલમ્
 નગરમ્ આગચ્છન્, 56 યીશોરન્વેષણં કૃત્વા મન્દિરે દાણમાનાઃ સન્તઃ
 પરસ્પરં વ્યાહરન્, યુષ્માકં કીદૃશો બોધો જાયતે? સ કિમ્ ઉત્સવેડસ્મિન્

અત્રાગમિષ્યતિ? 57 સ ય કુત્રાસ્તિ યદેતત્ કશ્ચિદ્ વેત્તિ તર્હિ દર્શયતુ
પ્રધાનયાજકાઃ ફિરુશિનશ્ચ તં ધર્તુ પૂર્વમ્ ઇમામ્ આજ્ઞાં પ્રાચારયન્ |

12 નિસ્તારોત્સવાત્ પૂર્વ દિનષટ્કે સ્થિતે યીશુ ર્થ પ્રમીતમ્ ઇલિયાસરં
શ્મશાનાદ્ ઉદસ્થાપરત્ તસ્ય નિવાસસ્થાનં બૈથનિયાગ્રામમ્ આગચ્છત્ | 2
તત્ર તદર્થ રજન્યાં ભોજ્યે કૃતે મર્થા પર્યવેષયદ્ ઇલિયાસર ય તસ્ય સક્ષિભિઃ
સાદ્ધ્ ભોજનાસન ઉપાવિશત્ | 3 તદા મરિયમ્ અર્દ્ધસેટકં બહુમૂલ્યં
જટામાંસીયં તૈલમ્ આનીય યીશોશ્ચરણયો મર્દ્યિત્વા નિજકેશ મર્દ્યિમ્
આરભત; તદા તૈલસ્ય પરિમલેન ગૃહમ્ આમોદિતમ્ અભવત્ | 4 યઃ
શિમોનઃ પુત્ર રિષ્કરિયોતીયો ચિહૂદાનામા યીશુ પરકરેષુ સમર્પયિષ્યતિ
સ શિષ્યસ્તદા કથિતવાન્, 5 એતત્તૈલં ત્રિભિઃ શતૈ મુદ્રાપદૈ વિક્રીતં સદ્
દરિદ્રેભ્યઃ કુતો નાદીયત? 6 સ દરિદ્રલોકાર્થમ્ અચિન્તયદ્ ઇતિ ન, કિન્તુ
સ ચૌર એવં તન્નિકટે મુદ્રાસમ્પુટકસ્થિત્યા તન્મધ્યે યદતિષ્ઠત્ તદપાહરત્
તસ્માત્ કારણાદ્ ઇમાં કથામકથયત્ | 7 તદા યીશુરકથયદ્ એનાં મા વારય
સા મમ શ્મશાનસ્થાપનદિનાર્થ તદરક્ષયત્ | 8 દરિદ્રા યુષ્માકં સન્નિધૌ
સર્વદા તિષ્ઠન્તિ કિન્ત્વહં સર્વદા યુષ્માકં સન્નિધૌ ન તિષ્ઠામિ | 9 તતઃ પરં
યીશુસ્તત્રાસ્તીતિ વાર્તા શ્રુત્વા બહવો ચિહૂદીયાસ્તં શ્મશાનાદુત્થાપિતમ્
ઇલિયાસરઞ્ચ દ્રષ્ટું તત્ સ્થાનમ્ આગચ્છન | 10 તદા પ્રધાનયાજકાસ્તમ્
ઇલિયાસરમપિ સંહર્તુમ્ અમન્ત્રયન્; 11 યતસ્તેન બહવો ચિહૂદીયા ગત્વા
યીશૌ વ્યશ્વસન્ | 12 અનન્તરં યીશુ ચિહૂદીયાલમ્ નગરમ્ આગચ્છતીતિ
વાર્તા શ્રુત્વા પરેડહનિ ઉત્સવાગતા બહવો લોકાઃ 13 ખજર્જૂરપત્રાધાનીય
તં સાક્ષાત્ કર્તુ બહિરાગત્ય જય જયેતિ વાયં પ્રોચ્યૈ વર્કતુમ્ આરભન્ત,
ઇસ્રાયેલો યો રાજા પરમેશ્વરસ્ય નામ્નાગચ્છતિ સ ધન્યઃ | 14 તદા "હે
સિયોનઃ કન્યે મા ભૈષીઃ પશ્યાયં તવ રાજા ગર્દભશાવકમ્ આરુહ્યાગચ્છતિ"
15 ઇતિ શાસ્ત્રીયવચનಾನુસારેણ યીશુરેકં યુવગર્દભં પ્રાપ્ય તદુપર્યારોહત્ |
16 અસ્થાઃ ઘટનાયાસ્તાત્પર્યૈ શિષ્યાઃ પ્રથમં નાબુધ્યન્ત, કિન્તુ યીશૌ
મહિમાનં પ્રાપ્તે સતિ વાક્યમિદં તસ્મિન અકથ્યત લોકાશ્ચ તમ્પ્રતીત્યમ્
અકુર્વન્ ઇતિ તે સ્મૃતવન્તઃ | 17 સ ઇલિયાસરં શ્મશાનાદ્ આગન્તુમ્
આહ્વતવાન્ શ્મશાનાઞ્ચ ઉદસ્થાપયદ્ યે યે લોકાસ્તત્કર્મ્ય સાક્ષાદ્ અપશ્યન્
તે પ્રમાણં દાતુમ્ આરભન્ત | 18 સ એતાદૃશમ્ અદ્ભુતં કર્મકરોત્ તસ્ય

જનશ્રુતે લોકાસ્તં સાક્ષાત્ કર્તુમ્ આગચ્છન્ | 19 તતઃ ક્ષિરુશિનઃ પરસ્પરં
 વક્તુમ્ આરભન્ત યુષ્માકં સર્વાશ્રોષ્ટા વૃથા જાતાઃ, ઇતિ કિં યૂયં ન
 બુદ્ધ્યધ્વે? પશ્યત સર્વે લોકાસ્તસ્ય પશ્ચાદ્ધર્તિનોભવન્ | 20 ભજનં કર્તુમ્
 ઉત્સવાગતાનાં લોકાનાં કતિપયા જના અન્યદેશીયા આસન્, 21 તે
 ગાલીલીયબૈત્સૈદાનિવાસિનઃ ક્ષિલિપસ્ય સમીપમ્ આગત્ય વ્યાહરન્ હે
 મહેચ્છ વયં યીશું દ્રષ્ટુમ્ ઇચ્છામઃ | 22 તતઃ ક્ષિલિપો ગત્વા આન્દ્રિયમ્
 અવદત્ પશ્ચાદ્ આન્દ્રિયક્ષિલિપૌ યીશવે વાર્તામ્ અકથયતાં | 23 તદા
 યીશુઃ પ્રત્યુદિતવાન્ માનવસુતસ્ય મહિમપ્રાપ્તિસમય ઉપસ્થિતઃ | 24 અહં
 યુષ્માનતિયથાર્થં વદામિ, ધાન્યબીજં મૃત્તિકાયાં પતિત્વા યદિ ન મૃયતે
 તર્હોકાકી તિષ્ઠતિ કિન્તુ યદિ મૃયતે તર્હિ બહુગુણં ફલં ફલતિ | 25 યો
 જને નિજપ્રાણાન્ પ્રિયાન્ જાનાતિ સ તાન્ હારયિષ્યતિ કિન્તુ યે જન
 ઇહલોકે નિજપ્રાણાન્ અપ્રિયાન્ જાનાતિ સેનન્તાયુઃ પ્રાપ્તું તાન્ રક્ષિષ્યતિ |
 (aiōnios g166) 26 કશ્ચિદ્ યદિ મમ સેવકો ભવિતું વાચ્છતિ તર્હિ સ
 મમ પશ્ચાદ્ગામી ભવતુ, તસ્માદ્ અહં યત્ર તિષ્ઠામિ મમ સેવકેપિ તત્ર
 સ્થાસ્યતિ; યો જનો માં સેવતે મમ પિતાપિ તં સમ્મંસ્યતે | 27 સામ્પ્રતં
 મમ પ્રાણા વ્યાકુલા ભવન્તિ, તસ્માદ્ હે પિતર એતસ્માત્ સમયાન્ માં
 રક્ષ, ઇત્યહં કિં પ્રાર્થયિષ્યે? કિન્ત્વહમ્ એતત્સમયાર્થમ્ અવતીર્ણવાન્ |
 28 હે પિતઃ સ્વનામ્નો મહિમાનં પ્રકાશય; તનૈવ સ્વનામ્નો મહિમાનમ્
 અહં પ્રકાશયં પુનરપિ પ્રકાશયિષ્યામિ, એષા ગગણીયા વાણી તસ્મિન્
 સમયેડજાયત | 29 તચ્શ્રુત્વા સમીપસ્થલોકાનાં કેચિદ્ અવદન્ મેઘોડગર્જત્,
 કેચિદ્ અવદન્ સ્વર્ગીયદૂતોડનેન સહ કથામચકથત્ | 30 તદા યીશુઃ
 પ્રત્યવાદીત્, મદર્થં શબ્દોયં નાભૂત્ યુષ્મદર્થમેવાભૂત્ | 31 અધુના જગતોસ્ય
 વિચારઃ સમ્પત્સ્યતે, અધુનાસ્ય જગતઃ પતી રાજ્યાત્ ય્યોષ્યતિ | 32
 યદ્યદ્ પૃથિવ્યા ઊર્દ્ધ્વે પ્રોત્યાપિતોસ્મિ તર્હિ સર્વાન્ માનવાન્ સ્વસમીપમ્
 આકર્ષિષ્યામિ | 33 કથં તસ્ય મૃતિ ભવિષ્યતિ, એતદ્ બોધયિતું સ ઇમાં
 કથામ્ અકથયત્ | 34 તદા લોકા અકથયન્ સોભિષિક્તઃ સર્વદા તિષ્ઠતીતિ
 વ્યવસ્થાગ્રન્થે શ્રુતમ્ અસ્માભિઃ, તર્હિ મનુષ્યપુત્રઃ પ્રોત્યાપિતો ભવિષ્યતીતિ
 વાક્યં કથં વદસિ? મનુષ્યપુત્રોયં કઃ? (aiōn g165) 35 તદા યીશુરકથાયદ્
 યુષ્માભિઃ સાર્દ્ધમ્ અલ્પદિનાનિ જ્યોતિરાસ્તે, યથા યુષ્માન્ અન્ધકારો

નાચ્છાદયતિ તદર્થં યાવત્કાલં યુષ્માભિઃ સાર્દ્ધં જ્યોતિસ્તિષ્ઠતિ તાવત્કાલં ગચ્છતઃ; યો જનોઽન્ધકારે ગચ્છતિ સ કુત્ર યાતીતિ ન જાનાતિ | 36 અતએવ યાવત્કાલં યુષ્માકં નિકટે જ્યોતિરાસ્તે તાવત્કાલં જ્યોતીરૂપસન્તાના ભવિતું જ્યોતિષિ વિશ્વસિતઃ; ઇમાં કથાં કથયિત્વા યીશુઃ પ્રસ્થાય તેભ્યઃ સ્વં ગુપ્તવાન્ | 37 યદપિ યીશુસ્તેષાં સમક્ષમ્ એતાવદાશ્રય્યકર્મ્માણિ કૃતવાન્ તથાપિ તે તસ્મિન્ ન વ્યશ્વસન્ | 38 અતએવ કઃ પ્રત્યેતિ સુસંવાદં પરેશાસ્મત્ પ્રચારિતં? પ્રકાશતે પરેશસ્ય હસ્તઃ કસ્ય ચ સન્નિધૌ? યિશાયિભવિષ્યદ્વાદિના યદેતદ્ વાક્યમુક્તં તત્ સફલમ્ અભવત્ | 39 તે પ્રત્યેતું નાશન્કુવન્ તસ્મિન્ યિશાયિભવિષ્યદ્વાદિ પુનરવાદીદ્, 40 યદા, "તે નયને ન પશ્યન્તિ બુદ્ધિમિશ્ર ન બુદ્ધ્યન્તે તે મનઃસુ પરિવર્તિતેષુ ચ તાનહં યથા સ્વસ્થાન્ ન કરોમિ તથા સ તેષાં લોચનાન્યન્ધાનિ કૃત્વા તેષામન્તઃકરણાનિ ગાઢાનિ કરિષ્યતિ | " 41 યિશાયિયો યદા યીશો મંહિમાનં વિલોક્ય તસ્મિન્ કથામકથયત્ તદા ભવિષ્યદ્વાક્યમ્ ઈદૃશં પ્રકાશયત્ | 42 તથાપ્યધિપતિનાં બહવસ્તસ્મિન્ પ્રત્યાયન્ | કિન્તુ ફિરૂશિનસ્તાન્ ભજનગૃહાદ્ દૂરીકુર્વન્તીતિ ભયાત્ તે તં ન સ્વીકૃતવન્તઃ | 43 યત ઈશ્વરસ્ય પ્રશંસાતો માનવાનાં પ્રશંસાયાં તેઽપ્રિયન્ત | 44 તદા યીશુરુચ્યૈઃકારમ્ અકથયદ્ યો જનો મયિ વિશ્વસિતિ સ કેવલે મયિ વિશ્વસિતીતિ ન, સ મત્પ્રેરકેઽપિ વિશ્વસિતિ | 45 યો જનો માં પશ્યતિ સ મત્પ્રેરકમપિ પશ્યતિ | 46 યો જનો માં પ્રત્યેતિ સ યથાન્ધકારે ન તિષ્ઠતિ તદર્થમ્ અહં જ્યોતિઃસ્વરૂપો ભૂત્વા જગત્યસ્મિન્ અવતીર્ણવાન્ | 47 મમ કથાં શ્રુત્વા યદિ કશ્ચિન્ ન વિશ્વસિતિ તર્હિ તમહં દોષિણં ન કરોમિ, યતો હેતો જંગતો જનાનાં દોષાન્ નિશ્ચિતાન્ કર્તું નાગત્ય તાન્ પરિચાતુમ્ આગતોસ્મિ | 48 યઃ કશ્ચિન્ માં ન શ્રદ્ધાય મમ કથં ન ગૃહ્ણાતિ, અન્યસ્તં દોષિણં કરિષ્યતિ વસ્તુતસ્તુ યાં કથામહમ્ અચકથં સા કથા ચરમેઽન્હિ તં દોષિણં કરિષ્યતિ | 49 યતો હેતોરહં સ્વતઃ કિમપિ ન કથયામિ, કિં કિં મયા કથયિતવ્યં કિં સમુપદેષ્ટવ્યઞ્ચ ઇતિ મત્પ્રેરયિતા પિતા મામાજ્ઞાપયત્ | 50 તસ્ય સાજ્ઞા અનન્તાયુરિત્યહં જાનામિ, અતએવાહં યત્ કથયામિ તત્ પિતા યથાજ્ઞાપયત્ તથૈવ કથયામ્યહમ્ | (aiōnios g166)

13 નિસ્તારોત્સવસ્ય કિચ્ચિત્કાલાત્ પૂર્વં પૃથિવ્યાઃ પિતુઃ સમીપગમનસ્ય સમયઃ સન્નિકર્ષોભૂદ્ ઇતિ જ્ઞાત્વા યીશુરાપ્રથમાદ્ યેષુ

જગત્રવાસિષ્વાત્મીયલોકેષ પ્રેમ કરોતિ સ્મ તેષુ શેષં યાવત્ પ્રેમ કૃતવાન્ |
 2 પિતા તસ્ય હસ્તે સર્વ્યં સમર્પિતવાન્ સ્વયમ્ ઇશ્વરસ્ય સમીપાદ્
 આગચ્છદ્ ઇશ્વરસ્ય સમીપં યાસ્યતિ ચ, સર્વ્યાણ્યેતાનિ જ્ઞાત્વા રજન્યાં
 ભોજને સમ્પૂર્ણો સતિ, 3 યદા શૈતાન્ તં પરહસ્તેષુ સમર્પયિતું શિમોનઃ
 પુત્રસ્ય ઇષ્કારિયોતિયસ્ય ચિહ્નદા અન્તઃકરણે કુપ્રવૃત્તિં સમાર્પયત્, 4 તદા
 યીશુ ભોજનાસનાદ્ ઉત્થાય ગાત્રવસ્ત્રં મોચયિત્વા ગાત્રમાર્જનવસ્ત્રં
 ગૃહીત્વા તેન સ્વકટિમ્ અબધ્નાત્, 5 પશ્ચાદ્ એકપાત્રે જલમ્ અભિષિચ્ય
 શિષ્યાણાં પાદાન્ પ્રક્ષાલ્ય તેન કટિબદ્ધગાત્રમાર્જનવાસસા માર્દુ પ્રારભત |
 6 તતઃ શિમોન્પિતરસ્ય સમીપમાગતે સ ઉક્તવાન્ હે પ્રભો ભવાન્ કિં મમ
 પાદૌ પ્રક્ષાલયિષ્યતિ? 7 યીશુરુદિતવાન્ અહં ચત્ કરોમિ તત્ સમ્પ્રતિ ન
 જાનાસિ કિન્તુ પશ્ચાજ્ જ્ઞાસ્યસિ | 8 તતઃ પિતરઃ કથિતવાન્ ભવાન્ કદાપિ
 મમ પાદૌ ન પ્રક્ષાલયિષ્યતિ | યીશુરકથયદ્ યદિ ત્વાં ન પ્રક્ષાલયે તર્હિ મયિ
 તવ કોપ્યંશો નાસ્તિ | (aiōn g165) 9 તદા શિમોન્પિતરઃ કથિતવાન્ હે પ્રભો
 તર્હિ કેવલપાદૌ ન, મમ હસ્તૌ શિરશ્ચ પ્રક્ષાલયતુ | 10 તતો યીશુરવદ્ યો
 જનો ધૌતસ્તસ્ય સર્વ્યાંઙ્ગપરિષ્કૃતત્વાત્ પાદૌ વિનાન્યાંઙ્ગસ્ય પ્રક્ષાલનાપેક્ષા
 નાસ્તિ | યૂયં પરિષ્કૃતા ઇતિ સત્યં કિન્તુ ન સર્વ્યે, 11 યતો યો જનસ્તં
 પરકરેષુ સમર્પયિષ્યતિ તં સ જ્ઞાતવાન; અતએવ યૂયં સર્વ્યે ન પરિષ્કૃતા ઇમાં
 કથાં કથિતવાન્ | 12 ઇત્યં યીશુસ્તેષાં પાદાન્ પ્રક્ષાલ્ય વસ્ત્રં પરિધાયાસને
 સમુપવિશ્ય કથિતવાન્ અહં યુષ્માન્ પ્રતિ કિં કર્મ્માકાર્ષં જાનીથ? 13 યૂયં માં
 ગુરું પ્રભુઞ્ચ વદથ તત્ સત્યમેવ વદથ યતોહં સએવ ભવામિ | 14 યદહં
 પ્રભુ ગુરુશ્ચ સન્ યુષ્માકં પાદાન્ પ્રક્ષાલિતવાન્ તર્હિ યુષ્માકમપિ પરસ્પરં
 પાદપ્રક્ષાલનમ્ ઉચિતમ્ | 15 અહં યુષ્માન્ પ્રતિ યથા વ્યવાહરં યુષ્માન્ તથા
 વ્યવહર્તુમ્ એકં પન્થાનં દર્શિતવાન્ | 16 અહં યુષ્માનતિયથાર્થં વદામિ, પ્રભો
 દર્સો ન મહાન્ પ્રેરકાચ્ય પ્રેરિતો ન મહાન્ | 17 ઇમાં કથાં વિદિત્વા યદિ
 તદનુસારતઃ કર્મ્માણિ કુરુથ તર્હિ યૂયં ધન્યા ભવિષ્યથ | 18 સર્વ્યેષુ યુષ્માસુ
 કથામિમાં કથયામિ ઇતિ ન, યે મમ મનોનીતાસ્તાનહં જાનામિ, કિન્તુ મમ
 ભક્ષ્યાણિ યો ભુઙ્ક્તે મત્રાણપ્રાતિકૂલ્યતઃ | ઉત્થાપયતિ પાદસ્ય મૂલં સ
 એષ માનવઃ | યદેતદ્ ધર્મપુસ્તકસ્ય વચનં તદનુસારેણાવશ્યં ઘટિષ્યતે | 19
 અહં સ જન ઇત્યત્ર યથા યુષ્માકં વિશ્વાસો જાયતે તદર્થં એતાદૃશઘટનાત્

પૂર્વમ્ અહમિદાનીં યુષ્મભ્યમકથયમ્ | 20 અહં યુષ્માનતીવ યથાર્થં વદામિ,
 મયા પ્રેરિતં જનં ચો ગૃહ્ણાતિ સ મામેવ ગૃહ્ણાતિ યશ્ચ માં ગૃહ્ણાતિ સ મત્પ્રેરકં
 ગૃહ્ણાતિ | 21 એતાં કથાં કથયિત્વા યીશુ દુઃખી સન્ પ્રમાણં દત્વા કથિતવાન્
 અહં યુષ્માનતિયથાર્થં વદામિ યુષ્માકમ્ એકો જનો માં પરકરેષુ
 સમર્પયિષ્યતિ | 22 તતઃ સ કમુદિશ્ય કથામેતાં કથિતવાન્ ઇત્યત્ર સન્દિગ્ધાઃ
 શિષ્યાઃ પરસ્પરં મુખમાલોકયિતું પ્રારભન્ત | 23 તસ્મિન્ સમયે યીશુ
 ર્યસ્મિન્ અપ્રીયત સ શિષ્યસ્તસ્ય વક્ષઃસ્થલમ્ અવાલમ્બત | 24
 શિમોન્પિતરસ્તં સદ્ગ્રેતેનાવદત્, અયં કમુદિશ્ય કથામેતામ્ કથયતીતિ પૃચ્છ |
 25 તદા સ યીશો વક્ષઃસ્થલમ્ અવલમ્બ્ય પૃષ્ઠવાન્ હે પ્રભો સ જનઃ કઃ? 26
 તતો યીશુઃ પ્રત્યવદદ્ એકખાણં પૂપં મજ્જયિત્વા યસ્મૈ દાસ્યામિ સએવ
 સઃ; પશ્ચાત્ પૂપખાણં મેકં મજ્જયિત્વા શિમોનઃ પુત્રાય ઇષ્કરિયોતીયાય
 યિહૂદૈ દત્વાન્ | 27 તસ્મિન્ દત્તે સતિ શૈતાન્ તમાશ્રયત્; તદા યીશુસ્તમ્
 અવદત્ ત્વં યત્ કરિષ્યસિ તત્ ક્ષિપ્રં કુરુ | 28 કિન્તુ સ યેનાશયેન તાં
 કથામકથાયત્ તમ્ ઉપવિષ્ઠલોકાનાં કોપિ નાબુદ્યત; 29 કિન્તુ યિહૂદાઃ
 સમીપે મુદ્રાસમ્પુટકસ્થિતેઃ કેચિદ્ ઇત્યમ્ અબુદ્યન્ત પાર્વણાસાદનાર્થં
 કિમપિ દ્રવ્યં કેતું વા દરિદ્રેભ્યઃ કિન્ચિદ્ વિતરિતું કથિતવાન્ | 30 તદા
 પૂપખાણં ગ્રહણાત્ પરં સ તૂર્ણં બહિરગચ્છત્; રાત્રિશ્ચ સમુપસ્થિતા | 31
 યિહૂદૈ બહિર્ગતે યીશુરકથયદ્ ઇદાનીં માનવસુતસ્ય મહિમા પ્રકાશતે
 તેનેશ્વરસ્યાપિ મહિમા પ્રકાશતે | 32 યદિ તેનેશ્વરસ્ય મહિમા પ્રકાશતે
 તર્હીશ્વરોપિ સ્વેન તસ્ય મહિમાનં પ્રકાશયિષ્યતિ તૂર્ણમેવ પ્રકાશયિષ્યતિ |
 33 હે વત્સા અહં યુષ્માભિઃ સાર્દ્ધં કિન્ચિત્કાલમાત્રમ્ આસે, તતઃ પરં માં
 મૃગયિષ્યધ્વે કિન્ત્વહં યત્સ્થાનં યામિ તત્સ્થાનં યૂયં ગન્તું ન શક્ષ્યથ, યામિમાં
 કથાં યિહૂદીયેભ્યઃ કથિતવાન્ તથાધુના યુષ્મભ્યમપિ કથયામિ | 34 યૂયં
 પરસ્પરં પ્રીયધ્વમ્ અહં યુષ્માસુ યથા પ્રીયે યૂયમપિ પરસ્પરમ્ તથૈવ પ્રીયધ્વં,
 યુષ્માન્ ઇમાં નવીનામ્ આજ્ઞામ્ આદિશામિ | 35 તેનૈવ યદિ પરસ્પરં
 પ્રીયધ્વે તર્હિ લક્ષણેનાનેન યૂયં મમ શિષ્યા ઇતિ સર્વે જ્ઞાતું શક્ષ્યન્તિ | 36
 શિમોનપિતરઃ પૃષ્ઠવાન્ હે પ્રભો ભવાન્ કુત્ર યાસ્યતિ? તતો યીશુઃ પ્રત્યવદત્,
 અહં યત્સ્થાનં યામિ તત્સ્થાનં સામ્પ્રતં મમ પશ્ચાદ્ ગન્તું ન શક્નોષિ કિન્તુ
 પશ્ચાદ્ ગમિષ્યસિ | 37 તદા પિતરઃ પ્રત્યુદિતવાન્ હે પ્રભો સામ્પ્રતં કુતો

હેતોસ્તવ પશ્ચાદ્ ગન્તું ન શક્નોમિ? ત્વદર્થં પ્રાણાન્ દાતું શક્નોમિ | 38 તતો
 યીશુઃ પ્રત્યુક્તવાન્ મન્નિમિત્તં કિં પ્રાણાન્ દાતું શક્નોમિ? ત્વામહં યથાર્થ
 વદામિ, કુક્કુટરવાણાત્ પૂર્વ્યં ત્વં ત્રિ માર્મિ અપહ્નોષ્યસે |

14 મનોદુઃખિનો મા ભૂત; ઈશ્વરે વિશ્વસિત મયિ ચ વિશ્વસિત | 2 મમ
 પિતુ ગૃહે બહૂનિ વાસસ્થાનિ સન્તિ નો ચેત્ પૂર્વ્યં યુષ્માન્ અજ્ઞાપયિષ્યં
 યુષ્મદર્થં સ્થાનં સજ્જયિતું ગચ્છામિ | 3 યદિ ગત્વાહં યુષ્મન્નિમિત્તં સ્થાનં
 સજ્જયામિ તર્હિ પનરાગત્ય યુષ્માન્ સ્વસમીપં નેષ્યામિ, તતો યત્રાહં તિષ્ઠામિ
 તત્ર યૂયમપિ સ્થાસ્યથ | 4 અહં યત્સ્થાનં બ્રજામિ તત્સ્થાનં યૂયં જાનીથ
 તસ્ય પન્થાનમપિ જાનીથ | 5 તદા થોમા અવદત્, હે પ્રભો ભવાન્ કુત્ર યાતિ
 તદ્વ્યં ન જાનીમઃ, તર્હિ કથં પન્થાનં જ્ઞાતું શક્નુમઃ? 6 યીશુરકથયદ્ અહમેવ
 સત્યજીવનરૂપપથો મયા ન ગન્તા કોપિ પિતુઃ સમીપં ગન્તું ન શક્નોમિ | 7
 યદિ મામ્ અજ્ઞાસ્યત તર્હિ મમ પિતરમપ્યજ્ઞાસ્યત કિન્ત્વધુનાતસ્તં જાનીથ
 પશ્યથ ચ | 8 તદા ફિલિપઃ કથિતવાન્, હે પ્રભો પિતરં દર્શય તસ્માદસ્માકં
 યથેષ્ટં ભવિષ્યતિ | 9 તતો યીશુઃ પ્રત્યાવાદીત્, હે ફિલિપ યુષ્માભિઃ
 સાર્દ્ધમ્ એતાવદ્દિનાનિ સ્થિતમપિ માં કિં ન પ્રત્યભિજાનાસિ? યો જનો મામ્
 અપશ્યત્ સ પિતરમપ્યપશ્યત્ તર્હિ પિતરમ્ અસ્માન્ દર્શયેતિ કથાં કથં
 કથયસિ? 10 અહં પિતરિ તિષ્ઠામિ પિતા મયિ તિષ્ઠતીતિ કિં ત્વં ન પ્રત્યષિ?
 અહં યદ્વાક્યં વદામિ તત્ સ્વતો ન વદામિ કિન્તુ યઃ પિતા મયિ વિરાજતે સ
 એવ સર્વ્વકર્માણિ કરાતિ | 11 અતએવ પિતર્યહં તિષ્ઠામિ પિતા ચ મયિ
 તિષ્ઠતિ મમાસ્થાં કથાયાં પ્રત્યયં કુરુત, નો ચેત્ કર્મહેતોઃ પ્રત્યયં કુરુત | 12
 અહં યુષ્માનતિયથાર્થં વદામિ, યો જનો મયિ વિશ્વસિતિ સોહમિવ કર્માણિ
 કરિષ્યતિ વરં તતોપિ મહાકર્માણિ કરિષ્યતિ યતો હેતોરહં પિતુઃ સમીપં
 ગચ્છામિ | 13 યથા પુત્રોણ પિતુ મહિમા પ્રકાશતે તદર્થં મમ નામ પ્રોચ્ય
 યત્ પ્રાર્થયિષ્યધ્વે તત્ સફલં કરિષ્યામિ | 14 યદિ મમ નામ્ના યત્ કિન્ચિદ્
 યાયધ્વે તર્હિ તદહં સાધયિષ્યામિ | 15 યદિ મયિ પ્રીયધ્વે તર્હિ મમાજ્ઞાઃ
 સમાચરત | 16 તતો મયા પિતુઃ સમીપે પ્રાર્થિતે પિતા નિરન્તરં યુષ્માભિઃ
 સાર્દ્ધ સ્થાતુમ્ ઇતરમેકં સહાયમ્ અર્થાત્ સત્યમયમ્ આત્માનં યુષ્માકં નિકટં
 પ્રેષયિષ્યતિ | (aiōn g165) 17 એતજ્જગતો લોકાસ્તં ગ્રહીતું ન શક્નુવન્તિ
 યતસ્તે તં નાપશ્યન્ નાજનંશ્ચ કિન્તુ યૂયં જાનીથ યતો હેતોઃ સ યુષ્માકમન્ત

નિવસતિ યુષ્માકં મધ્યે સ્થાસ્યતિ ચ | 18 અહં યુષ્માન્ અનાથાન્ કૃત્વા
 ન યાસ્યામિ પુનરપિ યુષ્માકં સમીપમ્ આગમિષ્યામિ | 19 કિચત્કાલરત્
 પરમ્ અસ્ય જગતો લોકા માં પુનર્ન દ્રક્ષ્યન્તિ કિન્તુ યૂયં દ્રક્ષ્યથ; અહં
 જીવિષ્યામિ તસ્માત્ કારણાદ્ યૂયમપિ જીવિષ્યથ | 20 પિતર્યહમસ્મિ
 મયિ ચ યૂયં સ્થ, તથાહં યુષ્માસ્વસ્મિ તદપિ તદા જ્ઞાસ્યથ | 21 યો જનો
 મમાજ્ઞા ગૃહીત્વા તા આચરતિ સએવ મયિ પ્રીયતે; યો જનશ્ચ મયિ પ્રીયતે
 સએવ મમ પિતુઃ પ્રિયપાત્રં ભવિષ્યતિ, તથાહમપિ તસ્મિન્ પ્રીત્વા તસ્મૈ સ્વં
 પ્રકાશયિષ્યામિ | 22 તદા ઈષ્કરિયોતીયાદ્ અન્યો ચિહ્નુદાસ્તમવદત્, હે
 પ્રભો ભવાન્ જગતો લોકાનાં સન્નિઘૌ પ્રકાશિતો ન ભૂત્વાસ્માકં સન્નિઘૌ
 કુતઃ પ્રકાશિતો ભવિષ્યતિ? 23 તતો યીશુઃ પ્રત્યુદિતવાન્, યો જનો મયિ
 પ્રીયતે સ મમાજ્ઞા અપિ ગૃહ્ણતિ, તેન મમ પિતાપિ તસ્મિન્ પ્રેષ્યતે, આવાઞ્ચ
 તન્નિકટમાગત્ય તેન સહ નિવત્સ્યાવઃ | 24 યો જનો મયિ ન પ્રીયતે સ મમ
 કથા અપિ ન ગૃહ્ણતિ પુનશ્ચ યામિમાં કથાં યૂયં શૃણુથ સા કથા કેવલસ્ય
 મમ ન કિન્તુ મમ પ્રેરકો યઃ પિતા તસ્યાપિ કથા | 25 ઇદાનીં યુષ્માકં નિકટે
 વિધમાનોહમ્ એતાઃ સકલાઃ કથાઃ કથયામિ | 26 કિન્વિતઃ પરં પિત્રા યઃ
 સહાયોડર્થાત્ પવિત્ર આત્મા મમ નામ્નિ પ્રેરયિષ્યતિ સ સર્વ્વં શિક્ષયિત્વા
 મયોક્તાઃ સમસ્તાઃ કથા યુષ્માન્ સ્મારયિષ્યતિ | 27 અહં યુષ્માકં નિકટે
 શાન્તિં સ્થાપયિત્વા યામિ, નિજાં શાન્તિં યુષ્મભ્યં દદામિ, જગતો લોકા
 યથા દદાતિ તથાહં ન દદામિ; યુષ્માકમ્ અન્તઃકરણાનિ દુઃખિતાનિ ભીતાનિ
 ચ ન ભવન્તુ | 28 અહં ગત્વા પુનરપિ યુષ્માકં સમીપમ્ આગમિષ્યામિ
 મયોક્તં વાક્યમિદં યૂયમ્ અશ્રૌષ્ટ; યદિ મય્યપ્રેષ્યધ્વં તર્હ્યાહં પિતુઃ સમીપં
 ગચ્છામિ મમાસ્યાં કથાયાં યૂયમ્ અહ્લાદિષ્યધ્વં યતો મમ પિતા મત્તોપિ
 મહાન્ | 29 તસ્યા ઘટનાયાઃ સમયે યથા યુષ્માકં શ્રદ્ધા જાયતે તદર્થમ્ અહં
 તસ્યા ઘટનાયાઃ પૂર્વમ્ ઇદાનીં યુષ્માન્ એતાં વાર્તાં વદામિ | 30 ઇતઃ પરં
 યુષ્માભિઃ સહ મમ બહવ આલાપા ન ભવિષ્યન્તિ યતઃ કારણાદ્ એતસ્ય
 જગતઃ પતિરાગચ્છતિ કિન્તુ મયા સહ તસ્ય કોપિ સમ્બન્ધો નાસ્તિ | 31
 અહં પિતરિ પ્રેમ કરોમિ તથા પિતુ વિધિવત્ કર્માણિ કરોમીતિ યેન જગતો
 લોકા જાનન્તિ તદર્થમ્ ઉત્તિષ્ઠત વયં સ્થાનાદસ્માદ્ ગચ્છામ |

15 અહં સત્યદ્રાક્ષાલતાસ્વરૂપો મમ પિતા તૂધાનપરિચારકસ્વરૂપઞ્ચ | 2
મમ યાસુ શાખાસુ ફલાનિ ન ભવન્તિ તાઃ સ છિન્તિ તથા ફલવત્યઃ શાખા
યથાધિકફલાનિ ફલન્તિ તદર્થં તાઃ પરિષ્કરોતિ | 3 ઇદાનીં મયોક્તોપદેશેન
યૂયં પરિષ્કૃતાઃ | 4 અતઃ કારણાત્ મયિ તિષ્ઠત તેનાહમપિ યુષ્માસુ તિષ્ઠામિ,
યતો હેતો દ્રાક્ષાલતાયામ્ અસંલગ્ના શાખા યથા ફલવતી ભવિતું ન
શક્નોતિ તથા યૂયમપિ મય્યતિષ્ઠન્તઃ ફલવન્તો ભવિતું ન શક્નુથ | 5
અહં દ્રાક્ષાલતાસ્વરૂપો યૂયઞ્ચ શાખાસ્વરૂપોઃ; યો જનો મયિ તિષ્ઠતિ યત્ર
યાહં તિષ્ઠામિ, સ પ્રચૂરફલૈઃ ફલવાન્ ભવતિ, કિન્તુ માં વિના યૂયં કિમપિ
કર્તું ન શક્નુથ | 6 યઃ કશ્ચિન્ મયિ ન તિષ્ઠતિ સ શુષ્કશાખેવ બહિ
ર્નિક્ષિપ્યતે લોકાશ્ચ તા આહત્ય વહ્નો નિક્ષિપ્ય દાહ્યન્તિ | 7 યદિ યૂયં
મયિ તિષ્ઠથ મમ કથા ય યુષ્માસુ તિષ્ઠતિ તર્હિ યદ્ વાગ્ધિત્વા યાયિષ્યધ્વે
યુષ્માકં તદેવ સફલં ભવિષ્યતિ | 8 યદિ યૂયં પ્રચૂરફલવન્તો ભવથ
તર્હિ તદ્વારા મમ પિતુર્ મહિમા પ્રકાશિષ્યતે તથા યૂયં મમ શિષ્યા ઇતિ
પરિક્ષાયિષ્યધ્વે | 9 પિતા યથા મયિ પ્રીતવાન્ અહમપિ યુષ્માસુ તથા
પ્રીતવાન્ અતો હેતો યૂયં નિરન્તરં મમ પ્રેમપાત્રાણિ ભૂત્વા તિષ્ઠત | 10
અહં યથા પિતુરાજ્ઞા ગૃહીત્વા તસ્ય પ્રેમભાજનં તિષ્ઠામિ તથૈવ યૂયમપિ
યદિ મમાજ્ઞા ગુહ્લીથ તર્હિ મમ પ્રેમભાજનાનિ સ્થાસ્યથ | 11 યુષ્મન્નિમિતં
મમ ય આહ્લાદઃ સ યથા ચિરં તિષ્ઠતિ યુષ્માકમ્ આનન્દશ્ચ યથા પૂર્યતે
તદર્થં યુષ્મભ્યમ્ એતાઃ કથા અત્રકથમ્ | 12 અહં યુષ્માસુ યથા પ્રીયે
યૂયમપિ પરસ્પરં તથા પ્રીયધ્વમ્ એષા મમાજ્ઞા | 13 મિત્રાણાં કારણાત્
સ્વપ્રાણદાનપર્યન્તં યત્ પ્રેમ તસ્માન્ મહાપ્રેમ કસ્યાપિ નાસ્તિ | 14 અહં
યદદ્ આદિશામિ તત્તદેવ યદિ યૂયમ્ આચરત તર્હિ યૂયમેવ મમ મિત્રાણિ |
15 અધારભ્ય યુષ્માન્ દાસાન્ ન વદિષ્યામિ યત્ પ્રભુ ર્યત્ કરોતિ દાસસ્તદ્ ન
જાનાતિ; કિન્તુ પિતુઃ સમીપે યદદ્ અશૃણવં તત્ સર્વ્વં યુષ્માન્ અજ્ઞાપયમ્
તત્કારણાદ્ યુષ્માન્ મિત્રાણિ પ્રોક્તવાન્ | 16 યૂયં માં રોચિતવન્ત ઇતિ ન,
કિન્ત્વહમેવ યુષ્માન્ રોચિતવાન્ યૂયં ગત્વા યથા ફલાન્યુત્પાદયથ તાનિ
ફલાનિ ચાક્ષ્યાણિ ભવન્તિ, તદર્થં યુષ્માન્ ન્યજુનજં તસ્માન્ મમ નામ
પ્રોચ્ય પિતરં યત્ કિન્ચિદ્ યાયિષ્યધ્વે તદેવ સ યુષ્મભ્યં દાસ્યતિ | 17
યૂયં પરસ્પરં પ્રીયધ્વમ્ અહમ્ ઇત્યાજ્ઞાપયામિ | 18 જગતો લોકૈ યુષ્માસુ

ઋતીયિતેષુ તે પૂર્વ્ય મામેવાર્તીયન્ત ઇતિ યૂયં જાનીથ | 19 યદિ યૂયં જગતો લોકા અભવિષ્યત તર્હિ જગતો લોકા યુષ્માન્ આત્મીયાન્ બુદ્ધ્વાપ્રેષ્યન્ત; કિન્તુ યૂયં જગતો લોકા ન ભવથ, અહં યુષ્માન્ અસ્માજજગતોડરોચયમ્ એતસ્માત્ કારણાજજગતો લોકા યુષ્માન્ ઋતીયન્તે | 20 દાસઃ પ્રભોર્મહાન્ ન ભવતિ મમૈતત્ પૂર્વ્યીયં વાક્યં સ્મરત; તે યદિ મામેવાતાડયન્ તર્હિ યુષ્માનપિ તાડયિષ્યન્તિ, યદિ મમ વાક્યં ગૃહ્ણન્તિ તર્હિ યુષ્માકમપિ વાક્યં ગ્રહીષ્યન્તિ | 21 કિન્તુ તે મમ નામકારણાદ્ યુષ્માન્ પ્રતિ તાદૃશં વ્યવહરિષ્યન્તિ યતો યો માં પ્રેરિતવાન્ તં તે ન જાનન્તિ | 22 તેષાં સન્નિધિમ્ આગત્ય યદહં નાકથયિષ્યં તર્હિ તેષાં પાપં નાભવિષ્યત્ કિન્ત્વધુના તેષાં પાપમાચ્છાદયિતુમ્ ઉપાયો નાસ્તિ | 23 યો જનો મામ્ ઋતીયતે સ મમ પિતરમપિ ઋતીયતે | 24 યાદૃશાનિ કર્માણિ કેનાપિ કદાપિ નાક્રિયન્ત તાદૃશાનિ કર્માણિ યદિ તેષાં સાક્ષાદ્ અહં નાકરિષ્યં તર્હિ તેષાં પાપં નાભવિષ્યત્ કિન્ત્વધુના તે દૃષ્ટ્વાપિ માં મમ પિતરઞ્ચાર્તીયન્ત | 25 તસ્માત્ તેડકારણં મામ્ ઋતીયન્તે યદેતદ્ વચનં તેષાં શાસ્ત્રે લિખિતમાસ્તે તત્ સફલમ્ અભવત્ | 26 કિન્તુ પિતુર્નિર્ગતં યં સહાયમર્થાત્ સત્યમયમ્ આત્માનં પિતુઃ સમીપાદ્ યુષ્માકં સમીપે પ્રેષયિષ્યામિ સ આગત્ય મયિ પ્રમાણં દાસ્યતિ | 27 યૂયં પ્રથમમારભ્ય મયા સાર્દ્ધં તિષ્ઠથ તસ્માદ્દેતો ર્યૂયમપિ પ્રમાણં દાસ્યથ |

16 યુષ્માકં યથા વાધા ન જાયતે તદર્થં યુષ્માન્ એતાનિ સર્વ્વવાક્યાનિ વ્યાહરં | 2 લોકા યુષ્માન્ ભજનગૃહેભ્યો દૂરીકરિષ્યન્તિ તથા યસ્મિન્ સમયે યુષ્માન્ હત્વા ઈશ્વરસ્ય તુષ્ટિ જનકં કર્માકુર્મ્મ ઇતિ મંસ્યન્તે સ સમય આગચ્છન્તિ | 3 તે પિતરં માઞ્ચ ન જાનન્તિ, તસ્માદ્ યુષ્માન્ પ્રતીદૃશમ્ આચરિષ્યન્તિ | 4 અતો હેતાઃ સમયે સમુપસ્થિતે યથા મમ કથા યુષ્માકં મનઃસુઃ સમુપતિષ્ઠતિ તદર્થં યુષ્માભ્યમ્ એતાં કથાં કથયામિ યુષ્માભિઃ સાર્દ્ધમ્ અહં તિષ્ઠન્ પ્રથમં તાં યુષ્માભ્યં નાકથયં | 5 સામ્પ્રતં સ્વસ્ય પ્રેરયિતુઃ સમીપં ગચ્છામિ તથાપિ ત્વં ક્ક ગચ્છસિ કથામેતાં યુષ્માકં કોપિ માં ન પૃચ્છતિ | 6 કિન્તુ મયોક્તાભિરાભિઃ કથાભિ ર્યૂષ્માકમ્ અન્તઃકરણાનિ દુઃખેન પૂર્ણાન્યભવન્ | 7 તથાપ્યહં યથાર્થં કથયામિ મમ ગમનં યુષ્માકં હિતાર્થમેવ, યતો હેતોર્ગમને ન કૃતે સહાયો યુષ્માકં સમીપં નાગમિષ્યતિ

કિન્તુ યદિ ગચ્છામિ તર્હિ યુષ્માકં સમીપે તં પ્રેષયિષ્યામિ | 8 તતઃ સ
 આગત્ય પાપપુણ્યદણ્ડેષુ જગતો લોકાનાં પ્રબોધં જનયિષ્યતિ | 9 તે મયિ
 ન વિશ્વસન્તિ તસ્માદ્દેતોઃ પાપપ્રબોધં જનયિષ્યતિ | 10 યુષ્માકમ્ અદૃશ્યઃ
 સન્નહં પિતુઃ સમીપં ગચ્છામિ તસ્માદ્ પુણ્યે પ્રબોધં જનયિષ્યતિ | 11
 એતજજગતોઽધિપતિ દંડાજ્ઞાં પ્રાપ્નોતિ તસ્માદ્ દણ્ડે પ્રબોધં જનયિષ્યતિ |
 12 યુષ્મભ્યં કથયિતું મમાનેકાઃ કથા આસતે, તાઃ કથા ઇદાનીં યૂયં સોદું
 ન શક્નુથઃ | 13 કિન્તુ સત્યમય આત્મા યદા સમાગમિષ્યતિ તદા સર્વ્યં
 સત્યં યુષ્માન્ નેષ્યતિ, સ સ્વતઃ કિમપિ ન વદિષ્યતિ કિન્તુ યચ્છ્રોષ્યતિ
 તદેવ કથયિત્વા ભાવિકાર્ય્યં યુષ્માન્ જ્ઞાપયિષ્યતિ | 14 મમ મહિમાનં
 પ્રકાશયિષ્યતિ યતો મદીયાં કથાં ગૃહીત્વા યુષ્માન્ બોધયિષ્યતિ | 15
 પિતુ ર્યંધદ્ આસ્તે તત્ સર્વ્યં મમ તસ્માદ્ કારણાદ્ અવાદિષં સ મદીયાં
 કથાં ગૃહીત્વા યુષ્માન્ બોધયિષ્યતિ | 16 કિયત્કાલાત્ પરં યૂયં માં દ્રષ્ટું ન
 લપ્સ્યધ્વે કિન્તુ કિયત્કાલાત્ પરં પુન દ્રષ્ટું લપ્સ્યધ્વે યતોહં પિતુઃ સમીપં
 ગચ્છામિ | 17 તતઃ શિષ્યાણાં કિયન્તો જનાઃ પરસ્પરં વદિતુમ્ આરભન્ત,
 કિયત્કાલાત્ પરં માં દ્રષ્ટું ન લપ્સ્યધ્વે કિન્તુ કિયત્કાલાત્ પરં પુન દ્રષ્ટું લપ્સ્યધ્વે
 યતોહં પિતુઃ સમીપં ગચ્છામિ, ઇતિ યદ્ વાક્યમ્ અયં વદતિ તત્ કિં? 18
 તતઃ કિયત્કાલાત્ પરમ્ ઇતિ તસ્ય વાક્યં કિં? તસ્ય વાક્યસ્યાભિપ્રાયં
 વયં બોદું ન શક્નુમસ્તૈરિતિ 19 નિગદિતે યીશુસ્તેષાં પ્રશ્નેચ્છાં જ્ઞાત્વા
 તેભ્યોઽકથયત્ કિયત્કાલાત્ પરં માં દ્રષ્ટું ન લપ્સ્યધ્વે, કિન્તુ કિયત્કાલાત્ પરં
 પૂન દ્રષ્ટું લપ્સ્યધ્વે, યામિમાં કથામકથયં તસ્યા અભિપ્રાયં કિં યૂયં પરસ્પરં
 મૃગયધ્વે? 20 યુષ્માનહમ્ અતિયથાર્થં વદામિ યૂયં ક્ષન્દિષ્યથ વિલપિષ્યથ
 ચ, કિન્તુ જગતો લોકા આનન્દિષ્યન્તિ; યૂયં શોકાકુલા ભવિષ્યથ કિન્તુ
 શોકાત્ પરં આનન્દયુક્તા ભવિષ્યથ | 21 પ્રસવકાલ ઉપસ્થિતે નારી યથા
 પ્રસવવેદનયા વ્યાકુલા ભવતિ કિન્તુ પુત્રે ભૂમિષ્ઠે સતિ મનુષ્યૈકો જન્મના
 નરલોકે પ્રવિષ્ટ ઇત્યાનન્દાત્ તસ્યાસ્તત્સર્વ્યં દુઃખં મનસિ ન તિષ્ઠતિ, 22 તથા
 યૂયમપિ સામ્પ્રતં શોકાકુલા ભવથ કિન્તુ પુનરપિ યુષ્મભ્યં દર્શનં દાસ્યામિ
 તેન યુષ્માકમ્ અન્તઃકરણાનિ સાનન્દાનિ ભવિષ્યન્તિ, યુષ્માકં તમ્ આનન્દઞ્ચ
 કોપિ હર્તું ન શક્યતિ | 23 તસ્મિન્ દિવસે કામપિ કથાં માં ન પ્રક્ષયથ |
 યુષ્માનહમ્ અતિયથાર્થં વદામિ, મમ નામ્ના યત્ કિન્દ્રિદ્ પિતરં યાયિષ્યધ્વે

તદેવ સ દાસ્યતિ | 24 પૂર્વે મમ નામ્ના કિમપિ નાયાયધ્વં, યાયધ્વં તતઃ
પ્રાપ્સ્યથ તસ્માદ્ યુષ્માકં સમ્પૂર્ણાનન્દો જનિષ્યતે | 25 ઉપમાકથાભિઃ
સર્વાણ્યેતાનિ યુષ્માન્ જ્ઞાપિતવાન્ કિન્તુ યસ્મિન્ સમયે ઉપમયા નોક્ત્વા
પિતુઃ કથાં સ્પષ્ટં જ્ઞાપયિષ્યામિ સમય એતાદૃશ આગચ્છતિ | 26 તદા મમ
નામ્ના પ્રાર્થયિષ્યધ્વે ડહં યુષ્મન્નિમિત્તં પિતરં વિનેષ્યે કથામિમાં ન વદામિ;
27 યતો યૂયં મયિ પ્રેમ કુરુથ, તથાહમ્ ઈશ્વરસ્ય સમીપાદ્ આગતવાન્
ઈત્યપિ પ્રતીથ, તસ્માદ્ કારણાત્ કારણાત્ પિતા સ્વયં યુષ્માસુ પ્રીયતે | 28
પિતુઃ સમીપાજજજદ્ આગતોસ્મિ જગત્ પરિત્યજ્ય ચ પુનરપિ પિતુઃ સમીપં
ગચ્છામિ | 29 તદા શિષ્યા અવદન્, હે પ્રભો ભવાન્ ઉપમયા નોક્ત્વાધુના
સ્પષ્ટં વદતિ | 30 ભવાન્ સર્વ્વજ્ઞઃ કેનચિત્ પૃથો ભવિતુમપિ ભવતઃ પ્રયોજનં
નાસ્તીત્યધુનાસ્માકં સ્થિરજ્ઞાનં જાતં તસ્માદ્ ભવાન્ ઈશ્વરસ્ય સમીપાદ્
આગતવાન્ ઈત્યત્ર વયં વિશ્વસિમઃ | 31 તતો યીશુઃ પ્રત્યવાદીદ્ ઇદાનીં કિં
યૂયં વિશ્વસિથ? 32 પશ્યત સર્વ્વે યૂયં વિકીર્ણાઃ સન્તો મામ્ એકાકિનં
પીરત્યજ્ય સ્વં સ્વં સ્થાનં ગમિષ્યથ, એતાદૃશઃ સમય આગચ્છતિ વરં
પ્રાયેણોપસ્થિતવાન્; તથાપ્યહં નૈકાકી ભવામિ યતઃ પિતા મયા સાદ્ધ્મ્
આસ્તે | 33 યથા મયા યુષ્માકં શાન્તિ જ્ઞાયતે તદર્થમ્ એતાઃ કથા યુષ્મભ્યમ્
અચકથં; અસ્મિન્ જગતિ યુષ્માકં કલેશો ઘટિષ્યતે કિન્ત્વક્ષોભા ભવત યતો
મયા જગજ્જિજતં |

17 તતઃ પરં યીશુરેતાઃ કથાઃ કથયિત્વા સ્વર્ગં વિલોક્યૈતત્ પ્રાર્થયત્,
હે પિતઃ સમય ઉપસ્થિતવાન્; યથા તવ પુત્રસ્તવ મહિમાનં પ્રકાશયતિ
તદર્થં ત્વં નિજપુત્રસ્ય મહિમાનં પ્રકાશય | 2 ત્વં ચોલ્લોકાન્ તસ્ય હસ્તે
સમર્પિતવાન્ સ યથા તેભ્યોડનન્તાયુ દ્દદાતિ તદર્થં ત્વં પ્રાણિમાત્રાણામ્
અધિપતિત્વભારં તસ્મૈ દત્તવાન્ | (aiōnios g166) 3 યસ્ત્વમ્ અદ્વિતીયઃ સત્ય
ઈશ્વરસ્ત્વયા પ્રેરિતશ્ચ યીશુઃ ખ્રીષ્ટ એતયોરુભયોઃ પરિચયે પ્રાપ્તેડનન્તાયુ
ભવતિ | (aiōnios g166) 4 ત્વં યસ્ય કર્મ્માણો ભારં મહાં દત્તવાન્, તત્
સમ્પન્નં કૃત્વા જગત્યસ્મિન્ તવ મહિમાનં પ્રાકાશયં | 5 અતએવ હે પિત
જ્ઞગત્યવિધમાને ત્વયા સહ તિષ્ઠતો મમ યો મહિમાસીત્ સમ્પ્રતિ તવ
સમીપે માં તં મહિમાનં પ્રાપય | 6 અન્યચ્ચ ત્વમ્ એતજ્જગતો ચાલ્લોકાન્
મહ્યમ્ અદદા અહં તેભ્યસ્તવ નામ્નસ્તત્ત્વજ્ઞાનમ્ અદદાં, તે તવૈવાસન્, ત્વં

તાન્ મહ્યમદદાઃ, તસ્માત્તે તવોપદેશમ્ અગૃહ્ણન્ | 7 ત્વં મહ્યં યત્ કિઞ્ચિદ્
 અદદાસ્તત્સર્વ્વં ત્વત્તો જાયતે ઇત્યધુનાજાનન્ | 8 મહ્યં યમુપદેશમ્ અદદા
 અહમપિ તેભ્યસ્તમુપદેશમ્ અદદાં તેપિ તમગૃહ્ણન્ ત્વત્તોહં નિર્ગત્ય ત્વયા
 પ્રેરિતોભવમ્ અત્ર ય વ્યશ્વસન્ | 9 તેષામેવ નિમિત્તં પ્રાર્થયેડહં જગતો
 લોકનિમિત્તં ન પ્રાર્થયે કિન્તુ યાલ્લોકાન્ મહ્યમ્ અદદાસ્તેષામેવ નિમિત્તં
 પ્રાર્થયેડહં યતસ્તે તવૈવાસતે | 10 યે મમ તે તવ યે ય તવ તે મમ તથા તૈ
 ર્મમ મહિમા પ્રકાશયતે | 11 સામ્પ્રતમ્ અસ્મિન્ જગતિ મમાવસ્થિતેઃ શેષમ્
 અભવત્ અહં તવ સમીપં ગચ્છામિ કિન્તુ તે જગતિ સ્થાસ્યન્તિ; હે પવિત્ર
 પિતરાવયો ર્યથૈકત્વમાસ્તે તથા તેષામધ્યેકત્વં ભવતિ તદર્થં યાલ્લોકાન્
 મહ્યમ્ અદદાસ્તાન્ સ્વનામ્ના રક્ષા | 12 યાવન્તિ દિનાનિ જગત્યસ્મિન્ તૈઃ
 સહાહમાસં તાવન્તિ દિનાનિ તાન્ તવ નામ્નાહં રક્ષિતવાન્; યાલ્લોકાન્ મહ્યમ્
 અદદાસ્તાન્ સર્વાન્ અહમરક્ષં, તેષાં મધ્યે કેવલં વિનાશપાત્રં હારિતં તેન
 ધર્મપુસ્તકસ્ય વચનં પ્રત્યક્ષં ભવતિ | 13 કિન્ત્વધુના તવ સન્નિધિં ગચ્છામિ
 મયા યથા તેષાં સમ્પૂર્ણાનન્દો ભવતિ તદર્થમહં જગતિ તિષ્ઠન્ એતાઃ કથા
 અકથયમ્ | 14 તવોપદેશં તેભ્યોડદદાં જગતા સહ યથા મમ સમ્બન્ધો નાસ્તિ
 તથા જજતા સહ તેષામપિ સમ્બન્ધાભાવાજ્ જગતો લોકાસ્તાન્ ઋતીયન્તે |
 15 ત્વં જગતસ્તાન્ ગૃહાણોતિ ન પ્રાર્થયે કિન્ત્વશુભાદ્ રક્ષેતિ પ્રાર્થયેહમ્ |
 16 અહં યથા જગત્સમ્બન્ધીયો ન ભવામિ તથા તેપિ જગત્સમ્બન્ધીયા
 ન ભવન્તિ | 17 તવ સત્યકથયા તાન્ પવિત્રીકુરુ તવ વાક્યમેવ સત્યં |
 18 ત્વં યથા માં જગતિ પ્રૈરયસ્તથાહમપિ તાન્ જગતિ પ્રૈરયં | 19 તેષાં
 હિતાર્થં યથાહં સ્વં પવિત્રીકરોમિ તથા સત્યકથયા તેપિ પવિત્રીભવન્તુ | 20
 કેવલં એતેષામર્થે પ્રાર્થયેડહમ્ ઇતિ ન કિન્ત્વેતેષામુપદેશેન યે જના મયિ
 વિશ્વસિષ્યન્તિ તેષામપ્યર્થે પ્રાર્થયેડહમ્ | 21 હે પિતસ્તેષાં સર્વેષામ્ એકત્વં
 ભવતુ તવ યથા મયિ મમ ય યથા ત્વચ્યેકત્વં તથા તેષામપ્યાવયોરેકત્વં ભવતુ
 તેન ત્વં માં પ્રેરિતવાન્ ઇતિ જગતો લોકાઃ પ્રતિયન્તુ | 22 યથાવયોરેકત્વં
 તથા તેષામધ્યેકત્વં ભવતુ તેષ્વહં મયિ ય ત્વમ્ ઇત્યં તેષાં સમ્પૂર્ણમેકત્વં
 ભવતુ, ત્વં પ્રેરિતવાન્ ત્વં મયિ યથા પ્રીયસે ય તથા તેષ્વપિ પ્રીતવાન્
 એતદથા જગતો લોકા જાનન્તિ 23 તદર્થં ત્વં યં મહિમાનં મહ્યમ્ અદદાસ્તં
 મહિમાનમ્ અહમપિ તેભ્યો દત્તવાન્ | 24 હે પિત જગતો નિર્માણાત્ પૂર્વ્યં

मयि स्नेहं कृत्वा यं मङ्गिमानं दत्तवान् मम तं मङ्गिमानं यथा ते पश्यन्ति तदर्थं
याल्लोकान् मह्यं दत्तवान् अहं यत्र तिष्ठामि तेपि यथा तत्र तिष्ठन्ति ममैषा
वाग्म्या | 25 दे यथार्थिक पित ऋगतो लोकैस्त्वय्यज्ञातेपि त्वामहं ज्ञाने त्वं
मां प्रेरितवान् एतीमे शिष्या जानन्ति | 26 यथाहं तेषु तिष्ठामि तथा मयि
येन प्रेम्ना प्रेमाकरोस्तत् तेषु तिष्ठति तदर्थं तव नामाहं तान् ज्ञापितवान्
पुनरपि ज्ञापयिष्यामि |

18 ताः कथाः कथयित्वा यीशुः शिष्यानादाय किद्रोन्नामकं स्रोत उत्तीर्य
शिष्यैः सः तत्रत्योधानं प्राविशत् | 2 किन्तु विश्वासघातिर्यिडूदास्तत्
स्थानं परिधीयते यतो यीशुः शिष्यैः सार्द्धं कदाचित् तत् स्थानम् अगच्छत् |
3 तदा स यिडूदाः सैन्यगणं प्रधानयाजकानां किद्रुशिनाञ्च पदातिगणञ्च
गृहीत्वा प्रदीपान् उल्कान् अस्त्राणि यादाय तस्मिन् स्थाने उपस्थितवान् |
4 स्वं प्रति यद् घटिष्यते तज् ज्ञात्वा यीशुरत्रेसरः सन् तानपृच्छत्
कं गवेषयथ? 5 ते प्रत्यवदन् नासरतीयं यीशुं; ततो यीशुरवादीद्
अहमेव सः; तैः सः विश्वासघाती यिडूदाश्चातिष्ठत् | 6 तदाहमेव स
तस्यैतां कथां श्रुत्वैव ते पश्चादेत्य भूमौ पतिताः | 7 ततो यीशुः पुनरपि
पृष्ठवान् कं गवेषयथ? ततस्ते प्रत्यवदन् नासरतीयं यीशुं | 8 तदा यीशुः
प्रत्युदितवान् अहमेव स एमां कथामयकथम्; यदि मामन्विच्छथ तर्हिमान्
गन्तुं मा वारयत | 9 एत्थं भूते मह्यं याल्लोकान् अददास्तेषाम् अेकमपि
नादारयम् एमां यां कथां स स्वयमकथयत् सा कथा सङ्गता | 10 तदा
शिमोनितरस्य निकटे ऋज्विस्थितेः स तं निष्कोषं कृत्वा मलायाजकस्य
माल्भनामानं दासम् आहृत्य तस्य दक्षिणार्कां छिन्नवान् | 11 ततो
यीशुः पितरम् अवदत्, ऋज् कोषे स्थापय मम पिता मह्यं पातुं यं कंसम्
अददात् तेनाहं किं न पास्यामि? 12 तदा सैन्यगणः सेनापति र्थिडूदीयानां
पदातयश्च यीशुं घृत्वा बद्ध्वा डानन्नाभनः कियङ्गाः श्वशुरस्य समीपं
प्रथमम् अनयन् | 13 स कियङ्गास्तस्मिन् वत्सरे मलायाजत्वपदे नियुक्तः
14 सन् साधारणलोकानां मङ्गलार्थम् अेकजनस्य मरणमुचितम् एति
यिडूदीयैः सार्द्धम् अमन्त्रयत् | 15 तदा शिमोनितरोऽन्यैकशिष्यश्च यीशोः
पश्चाद् अगच्छतां तस्यान्यशिष्यस्य मलायाजकेन परिचितत्वात् स यीशुना
सः मलायाजकस्याट्टालिकां प्राविशत् | 16 किन्तु पितरो बहिर्द्वारस्य

समीपेऽतिष्ठद् अतः एव मडायाजकेन परिचितः स शिष्यः पुनर्बहिर्गत्वा
 दौवायिकायै कथयित्वा पितरम् अब्यन्तरम् आनयत् | 17 तदा स द्वाररक्षिका
 पितरम् अवदत् त्वं किं न तस्य मानवस्य शिष्यः? ततः सोवदद् अहं
 न भवामि | 18 ततः परं यत्स्थाने दासाः पदातयश्च शीतलेतोरङ्गारै
 र्वह्निं प्रज्वाल्य तापं सेवितवन्तस्तत्स्थाने पितरस्तिष्ठन् तैः सह वह्नितापं
 सेवितुम् आरभत | 19 तदा शिष्येषूपदेशे य मडायाजकेन यीशुः पृष्ठः 20
 सन् प्रत्युक्तवान् सर्व्वलोकानां समक्षं कथामकथयं गुप्तं कामपि कथां न
 कथयित्वा यत् स्थानं यिद्धूदीयाः सततं गच्छन्ति तत्र भजनगोळे मन्दिरे
 याशिक्षयं | 21 मत्तः कुतः पृच्छसि? ये जना मद्रूपदेशम् अशृण्वन् तानेव
 पृच्छ यद् अवेदं ते तत् जानिन्त | 22 तदेत्थं प्रत्युदितत्वात् निकटस्थपदाति
 र्यीशुं यपेतेनाहृत्य व्याहरत् मडायाजकम् अवेदं प्रतिवदसि? 23 ततो यीशुः
 प्रतिगदितवान् यद्यथार्थम् अयकथं तर्हि तस्यायथार्थस्य प्रमाणं देहि,
 किन्तु यद्वि यथार्थं तर्हि कुतो लेतो मीम् अताडयः? 24 पूर्व्वं हानन् सभन्धनं
 तं कियद्मडायाजकस्य समीपं प्रैषयत् | 25 शिमोन्पितरस्तिष्ठन् वह्नितापं
 सेवते, अतस्मिन् समये कियन्तस्तम् अपृच्छन् त्वं किम् अेतस्य जनस्य
 शिष्यो न? ततः सोपहृत्याब्रवीद् अहं न भवामि | 26 तदा मडायाजकस्य
 यस्य दासस्य पितरः कर्णमच्छिनत् तस्य कुटुम्बः प्रत्युदितवान् उधाने तेन
 सह तिष्ठन्तं त्वां किं नापश्यं? 27 किन्तु पितरः पुनरपहृत्य कथितवान्
 तदानीं कुक्कुटोऽशैत् | 28 तदनन्तरं प्रत्यूषे ते कियद्मडायाजकम् अधिपते गृहं
 यीशुम् अनयन् किन्तु यस्मिन् अशुचित्वे जाते तैर्निस्तारोत्सवे न लोक्तव्यं,
 तस्य भयाद् यिद्धूदीयास्तद्गृहं नाविशन् | 29 अपरं पीलातो बहिरागत्य
 तान् पृष्ठवान् अेतस्य मनुष्यस्य कं द्रोषं वदथ? 30 तदा ते पेत्यवदन्
 दुष्कर्म्मकारिणि न सति भवतः समीपे नैनं समार्पयिष्यामः | 31 ततः
 पीलातोऽवदद् यूयमेनं गृहीत्वा स्वेषां व्यवस्थया विचारयत | तदा यिद्धूदीयाः
 प्रत्यवदन् कस्यापि मनुष्यस्य प्राणदण्डं कर्तुं नास्माकम् अधिकारोऽस्ति |
 32 अवेदं सति यीशुः स्वस्य मृत्यौ यां कथां कथितवान् सा सङ्गलाभवत् | 33
 तदनन्तरं पीलातः पुनरपि तद् राजगृहं गत्वा यीशुमाहूय पृष्ठवान् त्वं किं
 यिद्धूदीयानां राजा? 34 यीशुः प्रत्यवदत् त्वम् अेतां कथां स्वतः कथयसि
 किमन्यः कश्चिन् मयि कथितवान्? 35 पीलातोऽवदद् अहं किं यिद्धूदीयः?

તવ સ્વદેશીયા વિશેષતઃ પ્રધાનયાજકા મમ નિકટે ત્વાં સમાર્પયન્, ત્વં કિં કૃતવાન્? 36 યીશુઃ પ્રત્યવદત્ મમ રાજ્યમ્ એતજ્જગત્સમ્બન્ધીયં ન ભવતિ યદિ મમ રાજ્યં જગત્સમ્બન્ધીયમ્ અભવિષ્યત્ તર્હિં યિહૂદીયાનાં હસ્તેષુ યથા સમર્પિતો નાભવં તદર્થં મમ સેવકા અયોત્સ્યન્ કિન્તુ મમ રાજ્યમ્ ઐહિકં ન | 37 તદા પીલાતઃ કથિતવાન્, તર્હિં ત્વં રાજા ભવસિ? યીશુઃ પ્રત્યુક્તવાન્ ત્વં સત્યં કથયસિ, રાજાહં ભવામિ; સત્યતાયાં સાક્ષ્યં દાતું જર્નિં ગૃહીત્વા જગત્યસ્મિન્ અવતીર્ણવાન્, તસ્માત્ સત્યધર્મપક્ષપાતિનો મમ કથાં શૃણ્વન્તિ | 38 તદા સત્યં કિં? એતાં કથાં પષ્ટ્વા પીલાતઃ પુનરપિ બહિર્ગત્વા યિહૂદીયાન્ અભાષત, અહં તસ્ય કમપ્યપરાધં ન પ્રાપ્નોમિ | 39 નિસ્તારોત્સવસમયે યુષ્માભિરભિરુચિત એકો જનો મયા મોચયિતવ્ય એષા યુષ્માકં રીતિરસ્તિ, અતએવ યુષ્માકં નિકટે યિહૂદીયાનાં રાજાનં કિં મોચયામિ, યુષ્માકમ્ ઇચ્છા કા? 40 તદા તે સર્વે રુવન્તો વ્યાહરન્ એનં માનુષ્યં નહિ બરબ્બાં મોચય | કિન્તુ સ બરબ્બા દસ્યુરાસીત્ |

19 પીલાતો યીશુમ્ આનીય કશયા પ્રાહારયત્ | 2 પશ્ચાત્ સેનાગણઃ કણ્ટકનિર્મિતં મુકુટં તસ્ય મસ્તકે સમર્પ્ય વાર્તાકીવર્ણ રાજપરિચ્છદં પરિધાપ્ય, 3 હે યિહૂદીયાનાં રાજન્ નમસ્કાર ઇત્યુક્ત્વા તં ચપેટેનાહન્તુમ્ આરભત | 4 તદા પીલાતઃ પુનરપિ બહિર્ગત્વા લોકાન્ અવદત્, અસ્ય કમપ્યપરાધં ન લભેડહં, પશ્યત તદ્ યુષ્માન્ જ્ઞાપયિતું યુષ્માકં સન્નિધૌ બહિરેનમ્ આનયામિ | 5 તતઃ પરં યીશુઃ કણ્ટકમુકુટવાન્ વાર્તાકીવર્ણવસનવાંશ્ચ બહિરાગચ્છત્ | તતઃ પીલાત ઉક્તવાન્ એનં મનુષ્યં પશ્યત | 6 તદા પ્રધાનયાજકાઃ પદાતયશ્ચ તં દૃષ્ટ્વા, એનં કુશે વિધ, એનં કુશે વિધ, ઇત્યુક્ત્વા રવિતું આરભન્ત | તતઃ પીલાતઃ કથિતવાન્ યૂયં સ્વયમ્ એનં નીત્વા કુશે વિધત, અહમ્ એતસ્ય કમપ્યપરાધં ન પ્રાપ્તવાન્ | 7 યિહૂદીયાઃ પ્રત્યવદન્ અસ્માકં યા વ્યવસ્થાસ્તે તદનુસારેણાસ્ય પ્રાણહનનમ્ ઉચિતં યતોયં સ્વમ્ ઇશ્વરસ્ય પુત્રમવદત્ | 8 પીલાત ઇમાં કથાં શ્રુત્વા મહાત્રાસયુક્તઃ 9 સન્ પુનરપિ રાજગૃહ આગત્ય યીશું પૃષ્ટવાન્ ત્વં કુત્રત્યો લોકઃ? કિન્તુ યીશસ્તસ્ય કિમપિ પ્રત્યુત્તરં નાવદત્ | 10 ૧ તતઃ પીલાત્ કથિતવાન ત્વં કિં મયા સાર્દ્ધં ન સંલપિષ્યસિ? ત્વાં કુશે વેધિતું વા મોચયિતું શક્તિર્મમાસ્તે ઇતિ કિં ત્વં ન જાનાસિ? તદા યીશુઃ

પ્રત્યવદ્દ ઈશ્વરેણાદં મમોપરિ તવ કિમપ્યધિપતિત્વં ન વિધતે, તથાપિ
 યો જનો માં તવ હસ્તે સમાર્પયત્ તસ્ય મહાપાતકં જાતમ્ | 11 તદા
 યીશુઃ પ્રત્યવદ્દ ઈશ્વરેણાદત્તં મમોપરિ તવ કિમપ્યધિપતિત્વં ન વિધતે,
 તથાપિ યો જનો માં તવ હસ્તે સમાર્પયત્ તસ્ય મહાપાતકં જાતમ્ |
 12 તદારભ્ય પીલાતસ્તં મોચયિતું ચેષ્ટિતવાન્ કિન્તુ ચિહ્નૈયા રુવન્તો
 વ્યાહરન્ યદીમં માનવં ત્યજસિ તર્હિ ત્વં કૈસરસ્ય મિત્રં ન ભવસિ, યો
 જનઃ સ્વં રાજાનં વક્તિ સએવ કૈમરસ્ય વિરુદ્ધાં કથાં કથયતિ | 13 એતાં
 કથાં શ્રુત્વા પીલાતો યીશું બહિરાનીય નિસ્તારોત્સવસ્ય આસાદનદિનસ્ય
 દ્વિતીયપ્રહરાત્ પૂર્વ્ય પ્રસ્તરબન્ધનનામ્નિ સ્થાને ડર્થાત્ ઇબ્રીયભાષયા યદ્
 ગબ્બિથા કથ્યતે તસ્મિન્ સ્થાને વિચારાસન ઉપાવિશત્ | 14 અનન્તરં
 પીલાતો ચિહ્નૈયાન્ અવદત્, યુષ્માકં રાજાનં પશ્યત | 15 કિન્તુ એનં દૂરીકુરુ,
 એનં દૂરીકુરુ, એનં કુશે વિધ, ઇતિ કથાં કથયિત્વા તે રવિતુમ્ આરભન્ત;
 તદા પીલાતઃ કથિતવાન્ યુષ્માકં રાજાનં કિં કુશે વેધિષ્યામિ? પ્રધાનયાજકા
 ઉત્તરમ્ અવદન્ કૈસરં વિના કોપિ રાજાસ્માકં નાસ્તિ | 16 તતઃ પીલાતો
 યીશું કુશે વેધિતું તેષાં હસ્તેષુ સમાર્પયત્, તતસ્તે તં ધૃત્વા નીતવન્તઃ |
 17 તતઃ પરં યીશુઃ કુશે વહન્ શિરઃકપાલમ્ અર્થાદ્ યદ્ ઇબ્રીયભાષયા
 ગુલ્ગલ્તાં વદન્તિ તસ્મિન્ સ્થાને ઉપસ્થિતઃ | 18 તતસ્તે મધ્યસ્થાને તં
 તસ્યોભયપાશ્વે દ્વાવપરૌ કુશેડવિધન્ | 19 અપરમ્ એષ ચિહ્નૈયાનાં
 રાજા નાસરતીયયીશુઃ, ઇતિ વિજ્ઞાપનં લિખિત્વા પીલાતસ્તસ્ય કુશોપરિ
 સમયોજયત્ | 20 સા લિપિઃ ઇબ્રીયયૂનાનીયરોમીયભાષાભિ લિખિતા;
 યીશોઃ કુશવેધનસ્થાનં નગરસ્ય સમીપં, તસ્માદ્ બહવો ચિહ્નૈયાસ્તાં
 પઠિતુમ્ આરભન્ત | 21 ચિહ્નૈયાનાં પ્રધાનયાજકાઃ પીલાતમિતિ ન્યવેદયન્
 ચિહ્નૈયાનાં રાજેતિ વાક્યં ન કિન્તુ એષ સ્વં ચિહ્નૈયાનાં રાજાનમ્ અવદદ્
 ઇત્યં લિખતુ | 22 તતઃ પીલાત ઉત્તરં દત્તવાન્ ચલ્લેખનીયં તલ્લિખિતવાન્ |
 23 ઇત્યં સેનાગણો યીશું કુશે વિધિત્વા તસ્ય પરિઘેયવસ્ત્રં ચતુરો ભાગાન્
 કૃત્વા એકૈકસેના એકૈકભાગમ્ અગૃહ્ણત્ તસ્યોત્તરીયવસ્ત્રાગૃહ્ણત્ |
 કિન્તૂત્તરીયવસ્ત્રં સૂચિસેવનં વિના સર્વ્યમ્ ઊતં | 24 તસ્માત્તે વ્યાહરન્ એતત્
 કઃ પ્રાપ્સ્યતિ? તન્ન ખાડયિત્વા તત્ર ગુટિકાપાતં કરવામ | વિભજન્તેડધરીયં
 મે વસનં તે પરસ્પરં | મમોત્તરીયવસ્ત્રાર્થં ગુટિકાં પાતયન્તિ ચ | ઇતિ ચદ્વાક્યં

धर्मपुस्तके लिखितमास्ते तत् सेनागाणेनेत्थं व्यवहरणात् सिद्धमभवत्।
 25 तदानीं यीशो र्माता मातु र्भगिनी य या क्लियपा भाय्या भरियम्
 मग्दलीनी भरियम् य अेतास्तस्य कुशस्य सन्निधौ समतिष्ठन्। 26 ततो
 यीशुः स्वमातरं प्रियतमशिष्यञ्च समीपे दण्डायमानौ विलोक्य मातरम्
 अवदत्, हे योषिद् अेनं तव पुत्रं पश्य, 27 शिष्यन्त्ववदत्, अेनां तव मातरं
 पश्य। ततः स शिष्यस्तद्धटिकायां तां निजगृहं नीतवान्। 28 अनन्तरं
 सर्व्यं कर्माधुना सम्पन्नमभूत् यीशुरिति ज्ञात्वा धर्मपुस्तकस्य वयनं यथा
 सिद्धं भवति तदर्थम् अकथयत् मम पिपासा जाता। 29 ततस्तस्मिन् स्थाने
 अभ्रसेन पूर्णपात्रस्थित्या ते स्यञ्जमेकं तदभ्रसेनार्द्रीकृत्य असोऽनले
 तद् योजयित्वा तस्य मुष्णस्य सन्निधावस्थापयन्। 30 तदा यीशुरभ्रसं
 गृहीत्वा सर्व्यं सिद्धम् षति कथां कथयित्वा मस्तकं नमयन् प्राणान्
 पर्य्यत्यजत्। 31 तद्विनम् आसादनदिनं तस्मात् परेऽहनि विश्रामवारे देहा
 यथा कुशोपरि न तिष्ठन्ति, यतः स विश्रामवारो म्हादिनमासीत्, तस्माद्
 यिडूदीयाः पीलातनिकटं गत्वा तेषां पादभ्रजनस्य स्थानान्तरनयनस्य
 यानुमतिं प्रार्थयन्त। 32 अतः सेना आगत्य यीशुना सह कुशे षतयोः
 प्रथमद्वितीययोरयोः पादान् अभ्रजन्ः 33 किन्तु यीशोः सन्निधिं गत्वा स
 मृतं षति दृष्ट्वा तस्य पादौ नाभ्रजन्। 34 पश्चाद् अेको योद्धा शूलाघातेन
 तस्य कुक्षिम् अविधत् तत्क्षणात् तस्माद् रक्तं जलञ्च निरगच्छत्। 35 यो
 जनोऽस्य साक्ष्यं ददाति स स्वयं दृष्टवान् तस्येदं साक्ष्यं सत्यं तस्य कथा
 युष्माकं विश्वासं जनयितुं योग्या तत् स जानाति। 36 तस्यैकम् अस्थ्यपि
 न लक्ष्यते, 37 तद्दद् अन्यशास्त्रेपि लिख्यते, यथा, "दृष्टिपातं करिष्यन्ति
 तेऽविधन् यन्तु तम्प्रति। " 38 अरिमथीयनगरस्य यूषङ्नामा शिष्य अेक
 आसीत् किन्तु यिडूदीयेभ्यो भयात् प्रकाशितो न भवति; स यीशो र्दोहं
 नेतुं पीलातस्यानुमतिं प्रार्थयत्, ततः पीलातेनानुमते सति स गत्वा यीशो
 र्दोहम् अनयत्। 39 अपरं यो निकदीमो रात्रौ यीशोः समीपम् अगच्छत्
 सोपि गन्धरसेन मिश्रितं प्रायेण पञ्चाशत्सेटकमगुरुं गृहीत्वागच्छत्। 40
 ततस्ते यिडूदीयानां श्मशाने स्थापनरीत्यनुसारेण तत्सुगन्धिद्रव्येण सङ्घितं
 तस्य देहं वस्त्रेणावेष्टयन्। 41 अपरञ्च यत्र स्थाने तं कुशोऽविधन् तस्य
 निकटस्थोऽधाने यत्र किमपि मृतदेहं कदापि नास्थाप्यत् तादृशम् अेकं नूतनं

शमशानम् आसीत् | 42 यिडूदीयानाम् आसादनदिनागमनात् ते तस्मिन्
समीपस्थशमशाने यीशुम् अशाययन् |

20 अनन्तरं सप्ताहस्य प्रथमदिने ऽतिप्रत्यूषे ऽन्धकारे तिष्ठति मगदलीनी
मरियम् तस्य शमशानस्य निकटं गत्वा शमशानस्य मुखात् प्रस्तरमपसारितम्
अपश्यत् | 2 पश्चाद् धावित्वा शिमोन्पितराय यीशोः प्रियतमशिष्याय
येदम् अकथयत्, लोकाः शमशानात् प्रभुं नीत्वा कुत्रास्थापयन् तद् वक्तुं
न शक्नोमि | 3 अतः पितरः सोन्यशिष्यश्च बहिर् लुत्वा शमशानस्थानं
गन्तुम् आरभेतां | 4 उभयोर्धावतोः सोन्यशिष्यः पितरं पश्चात् त्यक्त्वा
पूर्वं शमशानस्थान उपस्थितवान् | 5 तदा प्रह्वीभूय स्थापितवस्त्राणि
दृष्टवान् किन्तु न प्राविशत् | 6 अपरं शिमोन्पितर आगत्य शमशानस्थानं
प्रविश्य 7 स्थापितवस्त्राणि मस्तकस्य वस्त्रञ्च पृथक् स्थानान्तरे स्थापितं
दृष्टवान् | 8 ततः शमशानस्थानं पूर्वम् आगतो योन्यशिष्यः सोपि
प्रविश्य तादृशं दृष्ट्वा व्यश्वसीत् | 9 यतः शमशानात् स उत्थापयितव्य
अेतस्य धर्मपुरतकवयनस्य भावं ते तदा वोढुं नाशक्नुवन् | 10 अनन्तरं
तौ द्वौ शिष्यौ स्वं स्वं गृहं परावृत्त्यागच्छताम् | 11 ततः परं मरियम्
शमशानद्वारस्य बहिः स्थित्वा रोदितुम् आरभत ततो रुदती प्रह्वीभूय
शमशानं विलोक्य 12 यीशोः शयनस्थानस्य शिरःस्थाने पदतले य द्वयो
र्दिशो द्वौ स्वर्गीयदूतावुपविष्टौ समपश्यत् | 13 तौ पृष्टवन्तौ हे नारि कुतो
रोदिषि? सावदत् लोका मम प्रभुं नीत्वा कुत्रास्थापयन् एति न जानामि | 14
एत्युक्त्वा मुभं परावृत्त्य यीशुं दण्डायमानम् अपश्यत् किन्तु स यीशुरिति
सा ज्ञातुं नाशक्नोत् | 15 तदा यीशुस्ताम् अपृच्छत् हे नारि कुतो रोदिषि?
कं वा मृगयसे? ततः सा तम् उधानसेवकं ज्ञात्वा व्याहरत्, हे मडेच्छ त्वं
यदीतः स्थानात् तं नीतवान् तर्हि कुत्रास्थापयस्तद् वद तत्स्थानात् तम्
आनयामि | 16 तदा यीशुस्ताम् अवदत् हे मरियम् | ततः सा परावृत्त्य
प्रत्यवदत् हे रब्बूनी अर्थात् हे गुरो | 17 तदा यीशुरवदत् मां मा धर,
एदानीं पितुः समीपे उर्ध्वगमनं न करोमि किन्तु यो मम युष्माकञ्च
पिता मम युष्माकञ्चेश्वरस्तस्य निकट उर्ध्वगमनं कर्तुम् उद्यतोस्मि,
एमां कथां त्वं गत्वा मम भ्रातृगाणं ज्ञापय | 18 ततो मगदलीनीमरियम्
तत्क्षणाद् गत्वा प्रभुस्तस्यै दर्शनं दत्वा कथा अेता अकथयद् एति वात्तां

શિષ્યેભ્યોડકથયત્ | 19 તતઃ પરં સપ્તાહસ્ય પ્રથમદિનસ્ય સન્ધ્યાસમયે શિષ્યા એકત્ર મિલિત્વા યિહૂદીયેભ્યો ભિયા દ્વારરુદ્ધમ્ અકુર્વન્, એતસ્મિન્ કાલે યીશુસ્તેષાં મધ્યસ્થાને તિષ્ઠન્ અકથયદ્ યુષ્માકં કલ્યાણં ભૂયાત્ | 20 ઇત્યુક્ત્વા નિજહસ્તં કુક્ષિઞ્ચ દર્શિતવાન્, તતઃ શિષ્યાઃ પ્રભું દૃષ્ટ્વા હૃષ્ટા અભવન્ | 21 યીશુઃ પુનરવદદ્ યુષ્માકં કલ્યાણં ભૂયાત્ પિતા યથા માં પ્રૈષયત્ તથાહમપિ યુષ્માન્ પ્રેષયામિ | 22 ઇત્યુક્ત્વા સ તેષામુપરિ દીર્ઘપ્રશ્વાસં દત્વા કથિતવાન્ પવિત્રમ્ આત્માનં ગૃહ્ણીત | 23 યૂયં યેષાં પાપાનિ મોચયિષ્યથ તે મોચયિષ્યન્તે યેષાઞ્ચ પાપાતિ ન મોચયિષ્યથ તે ન મોચયિષ્યન્તે | 24 દ્વાદશમધ્યે ગણિતો યમજો થોમાનામા શિષ્યો યીશોરાગમનકાલૈ તૈઃ સાર્દ્ધં નાસીત્ | 25 અતો વયં પ્રભૂમ્ અપશ્યામેતિ વાક્યેડન્યશિષ્યૈરુક્તે સોવદત્, તસ્ય હસ્તયો લૌહકીલકાનાં ચિહ્નં ન વિલોક્ય તચ્ચિહ્નમ્ અક્રુલ્યા ન સ્પૃષ્ટ્વા તસ્ય કુક્ષૌ હસ્તં નારોપ્ય ચાહં ન વિશ્વસિષ્યામિ | 26 અપરમ્ અષ્ટમેડહ્નિ ગતે સતિ થોમાસહિતઃ શિષ્યગણ એકત્ર મિલિત્વા દ્વારં રુદ્ધ્વાભ્યન્તર આસીત્, એતર્હિ યીશુસ્તેષાં મધ્યસ્થાને તિષ્ઠન્ અકથયત્, યુષ્માકં કુશલં ભૂયાત્ | 27 પશ્ચાત્ થામૈ કથિતવાન્ ત્વમ્ અક્રુલીમ્ અત્રાર્પયિત્વા મમ કરૌ પશ્ય કરં પ્રસાર્થ્ય મમ કુક્ષાવર્પય નાવિશ્વસ્ય | 28 તદા થોમા અવદત્, હે મમ પ્રભો હે મદીશ્વર | 29 યીશુરકથયત્, હે થોમા માં નિરીક્ષ્ય વિશ્વસિષિ યે ન દૃષ્ટ્વા વિશ્વસન્તિ તએવ ધન્યાઃ | 30 એતદન્યાનિ પુસ્તકેડસ્મિન્ અલિખિતાનિ બહૂન્યાશ્ચર્યકર્માણિ યીશુઃ શિષ્યાણાં પુસ્તાદ્ અકરોત્ | 31 કિન્તુ યીશુરીશ્વરસ્યાભિષિક્તઃ સુત એવેતિ યથા યૂયં વિશ્વસિથ વિશ્વસ્ય ચ તસ્ય નામ્ના પરમાયુઃ પ્રાપ્નુથ તદર્થમ્ એતાનિ સર્વાણ્યલિખ્યન્ત |

21 તતઃ પરં તિબિરિયાજલધેસ્તટે યીશુઃ પુનરપિ શિષ્યેભ્યો દર્શનં દત્તવાન્ દર્શનસ્યાખ્યાનમિદમ્ | 2 શિમોન્પિતરઃ યમજથોમા ગાલીલીયકાન્નાનગરનિવાસી નિથનેલ્ સિવદેઃ પુત્રાવન્યૌ દ્વૌ શિષ્યૌ ચૈતેષ્વેકત્ર મિલિતેષુ શિમોન્પિતરોડકથયત્ મત્સ્યાન્ ધર્તુ યામિ | 3 તતસ્તે વ્યાહરન્ તર્હિ વયમપિ ત્વયા સાર્દ્ધં યામઃ તદા તે બહિર્ગતાઃ સન્તઃ ક્ષિપ્રં નાવમ્ આરોહન્ કિન્તુ તસ્યાં રજન્યામ્ એકમપિ ન પ્રાપ્નુવન્ | 4 પ્રભાતે સતિ યીશુસ્તટે સ્થિતવાન્ કિન્તુ સ યીશુરિતિ શિષ્યા જ્ઞાતું

નાશકનુવન્ | 5 તદા યીશુરપૃચ્છત્, હે વત્સા સન્નિધૌ કિઞ્ચિત્ ખાધદ્રવ્યમ્
 આસ્તે? તેડવદન્ કિમપિ નાસ્તિ | 6 તદા સોડવદત્ નૌકાયા દક્ષિણપાર્શ્વે
 જાલં નિક્ષિપત તતો લપ્સ્યધ્વે, તસ્માત્ તૈ નિક્ષિપ્તે જાલે મત્સ્યા
 એતાવન્તોડપતન્ યેન તે જાલમાકૃષ્ય નોત્તોલયિતું શક્તાઃ | 7 તસ્માદ્
 યીશોઃ પ્રિયતમશિષ્યઃ પિતરાયાકથયત્ એષ પ્રભુ ભવેત્, એષ પ્રભુરિતિ
 વાયં શ્રુત્વૈવ શિમોન્ નગ્નતાહેતો મત્સ્યધારિણ ઉત્તરીયવસ્ત્રં પરિધાય
 હૃદં પ્રત્યુદલમ્કૃયત્ | 8 અપરે શિષ્યા મત્સ્યૈઃ સાઠ્ઠ્ જાલમ્ આકર્ષન્તઃ
 ક્ષુદ્રનૌકાં વાહયિત્વા કૂલમાનયન્ તે કૂલાદ્ અતિદૂરે નાસન્ દ્વિશતહસ્તેભ્યો
 દૂર આસન્ ઇત્યનુમીયતે | 9 તીરં પ્રાપ્તૈસ્તૈસ્તત્ર પ્રજ્વલિતાગ્નિસ્તદુપરિ
 મત્સ્યાઃ પૂપાશ્ચ દૃષ્ટાઃ | 10 તતો યીશુરકથયદ્ યાન્ મત્સ્યાન્ અધરત
 તેષાં કતિપયાન્ આનયત | 11 અતઃ શિમોન્પિતરઃ પરાવૃત્ય ગત્વા
 બૃહદ્ભિસ્ત્રિપત્રાશદધિકશતમત્સ્યૈઃ પરિપૂર્ણં તજજાલમ્ આકૃષ્યોદતોલયત્
 કિન્ત્વેતાવદ્ધિ મત્સ્યૈરપિ જાલં નાછિધત | 12 અનન્તરં યીશુસ્તાન્ અવાદીત્
 યૂયમાગત્ય ભુંગધ્વં; તદા સએવ પ્રભુરિતિ જ્ઞાતત્વાત્ ત્વં કઃ? ઇતિ પ્રશ્નું
 શિષ્યાણાં કસ્યાપિ પ્રગલ્ભતા નાભવત્ | 13 તતો યીશુરાગત્ય પૂપાન્
 મત્સ્યાંશ્ચ ગૃહીત્વા તેભ્યઃ પર્યવેષયત્ | 14 ઇત્યં શ્મશાનાદુત્થાનાત્ પરં
 યીશુઃ શિષ્યેભ્યસ્તૃતીયવારં દર્શનં દત્તવાન્ | 15 ભોજને સમાપ્તે સતિ યીશુઃ
 શિમોન્પિતરં પૃષ્ટવાન્, હે યૂનસઃ પુત્ર શિમોન્ ત્વં કિમ્ એતેભ્યોધિકં મયિ
 પ્રીયસે? તતઃ સ ઉદિતવાન્ સત્યં પ્રભો ત્વયિ પ્રીયેડહં તદ્ ભવાન્ જાનાતિ;
 તદા યીશુરકથયત્ તર્હિ મમ મેષશાવકગણં પાલય | 16 તતઃ સ દ્વિતીયવારં
 પૃષ્ટવાન્ હે યૂનસઃ પુત્ર શિમોન્ ત્વં કિં મયિ પ્રીયસે? તતઃ સ ઉક્તવાન્
 સત્યં પ્રભો ત્વયિ પ્રીયેડહં તદ્ ભવાન્ જાનાતિ; તદા યીશુરકથયત તર્હિ મમ
 મેષગણં પાલય | 17 પશ્ચાત્ સ તૃતીયવારં પૃષ્ટવાન્, હે યૂનસઃ પુત્ર શિમોન્
 ત્વં કિં મયિ પ્રીયસે? એતદ્વાક્યં તૃતીયવારં પૃષ્ટવાન્ તસ્માત્ પિતરો દુઃખિતો
 ભૂત્વાડકથયત્ હે પ્રભો ભવતઃ કિમધ્યગોચરં નાસ્તિ ત્વચ્ચહં પ્રીયે તદ્
 ભવાન્ જાનાતિ; તતો યીશુરવદત્ તર્હિ મમ મેષગણં પાલય | 18 અહં તુભ્યં
 યથાર્થં કથયામિ યૌવનકાલે સ્વયં બદ્ધકટિ યંત્રેચ્છા તત્ર યાતવાન્ કિન્ત્વિતઃ
 પરં વૃદ્ધે વયસિ હસ્તં વિસ્તારયિષ્યસિ, અન્યજનસ્ત્વાં બદ્ધવા યત્ર ગન્તું
 તવેચ્છા ન ભવતિ ત્વાં ધૃત્વા તત્ર નેચ્યતિ | 19 ફલતઃ કીદૃશેન મરણેન સ

ઈશ્વરસ્ય મહિમાનં પ્રકાશયિષ્યતિ તદ્ બોધયિતું સ ઇતિ વાક્યં પ્રોક્તવાન્ |
 ઇત્યુક્તે સતિ સ તમવોચત્ મમ પશ્ચાદ્ આગચ્છ | 20 યો જનો રાત્રિકાલે
 યીશો વંક્ષોડવલમ્બ્ય, હે પ્રભો કો ભવન્તં પરકરેષુ સમર્પયિષ્યતીતિ વાક્યં
 પૃષ્ટવાન્, તં યીશોઃ પ્રિયતમશિષ્યં પશ્ચાદ્ આગચ્છન્તં 21 પિતરો મુખં
 પરાવર્ત્ય વિલોક્ય યીશું પૃષ્ટવાન્, હે પ્રભો એતસ્ય માનવસ્ય કીદૃશી ગતિ
 ભવિષ્યતિ? 22 સ પ્રત્યવદત્, મમ પુનરાગમનપર્યન્તં યદિ તં સ્થાપયિતુમ્
 ઇચ્છામિ તત્ર તવ કિં? ત્વં મમ પશ્ચાદ્ આગચ્છ | 23 તસ્માત્ સ શિષ્યો
 ન મરિષ્યતીતિ ભ્રાતૃગણમધ્યે કિંવદન્તી જાતા કિન્તુ સ ન મરિષ્યતીતિ
 વાક્યં યીશુ નાંવદત્ કેવલં મમ પુનરાગમનપર્યન્તં યદિ તં સ્થાપયિતુમ્
 ઇચ્છામિ તત્ર તવ કિં? ઇતિ વાક્યમ્ ઉક્તવાન્ | 24 યો જન એતાનિ
 સર્વાણિ લિખિતવાન્ અત્ર સાક્ષ્યઞ્ચ દત્તવાન્ સએવ સ શિષ્યઃ, તસ્ય સાક્ષ્યં
 પ્રમાણમિતિ વયં જાનીમઃ | 25 યીશુરેતેભ્યોડપરાણ્યપિ બહૂનિ કર્માણિ
 કૃતવાન્ તાનિ સર્વાણિ યદેકેકં કૃત્વા લિખ્યન્તે તર્હિ ગ્રન્થા એતાવન્તો
 ભવન્તિ તેષાં ધારણે પૃથિવ્યાં સ્થાનં ન ભવતિ | ઇતિ | |

પ્રેરિતા:

1 હે થિયફિલ, યીશુ: સ્વમનોનીતાન્ પ્રેરિતાન્ પવિત્રેણાત્મના સમાદિશ્ય યસ્મિન્ દિને સ્વર્ગમારોહત્ યાં યાં ક્રિયામકરોત્ યદદ્ ઉપાદિશચ્ય તાનિ સર્વાણિ પૂર્વ્યં મયા લિખિતાનિ | 2 સ સ્વનિધનદુઃખભોગાત્ પરમ્ અનેકપ્રત્યયક્ષપ્રમાણૌ: સ્વં સજીવં દર્શયિત્વા 3 યત્વારિંશદ્દિનાનિ યાવત્ તેભ્ય: પ્રેરિતેભ્યો દર્શનં દત્ત્વેશ્વરીયરાજ્યસ્ય વર્ણનમ અકરોત્ | 4 અનન્તરં તેષાં સભાં કૃત્વા ઇત્યાજ્ઞાપયત્, યૂયં ચિરૂશાલમોડન્યત્ર ગમનમકૃત્વા યસ્તિન્ પિત્રાઙ્ગીકૃતે મમ વદનાત્ કથા અશૃણુત તત્પ્રાપ્તિમ્ અપેક્ષ્ય તિષ્ઠત | 5 યોહન્ જલે મજ્જિજતાવાન્ કિન્વલ્પદિનમધ્યે યૂયં પવિત્ર આત્મનિ મજ્જિજતા ભવિષ્યથ | 6 પશ્ચાત્ તે સર્વ્યે મિલિત્વા તમ્ અપૃચ્છન્ હે પ્રભો ભવાન્ કિમિદાનીં પુનરપિ રાજ્યમ્ ઇસ્રાયેલીયલોકાનાં કરેષુ સમર્પયિષ્યતિ? 7 તત: સોવદત્ યાન્ સર્વાન્ કાલાન્ સમયાંશ્ચ પિતા સ્વવશેડસ્થાપયત્ તાન્ જ્ઞાતું યુષ્માકમ્ અધિકારો ન જાયતે | 8 કિન્તુ યુષ્માસુ પવિત્રસ્યાત્મન આવિર્ભાવે સતિ યૂયં શક્તિં પ્રાપ્ય ચિરૂશાલમિ સમસ્તયિહૂદાશોમિરોણદેશયો: પૃથિવ્યા: સીમાં યાવદ્ યાવન્તો દેશાસ્તેષુ યર્વ્યેષુ ચ મયિ સાક્ષ્યં દાસ્યથ | 9 ઇતિ વાક્યમુકૃત્વા સ તેષાં સમક્ષં સ્વર્ગં નીતોડભવત્, તતો મેઘમારુદ્ધ તેષાં દૃષ્ટેરગોચરોડભવત્ | 10 યસ્મિન્ સમયે તે વિહાયસં પ્રત્યનન્યદૃષ્ટ્યા તસ્ય તાદૃશમ્ ઊર્દ્ધ્વગમનમ્ અપશ્યન્ તસ્મિન્નેવ સમયે શુકલવસ્ત્રૌ દ્વૌ જનૌ તેષાં સન્નિઘૌ દાડાયમાનૌ કથિતવન્તૌ, 11 હે ગાલીલીયલોકા યૂયં કિમર્થં ગગણં પ્રતિ નિરીક્ષ્ય દાડાયમાનાસ્તિષ્ઠથ? યુષ્માકં સમીપાત્ સ્વર્ગં નીતો યો યીશુસ્તં યૂયં યથા સ્વર્ગમ્ આરોહન્તમ્ અદર્શમ્ તથા સ પુનશ્ચાગમિષ્યતિ | 12 તત: પરં તે જૈતુનનામ્: પર્વતાદ્ વિશ્રામવારસ્ય પથ: પરિમાણમ્ અર્થાત્ પ્રાયેણાર્દ્ધકોશં દુરસ્થં ચિરૂશાલમ્નગરં પરાવૃત્યાગચ્છન્ | 13 નગરં પ્રવિશ્ય પિતરો યાકૂબ્ યોહન્ આન્દ્રિય: ફિલિપ: થોમા બર્થજમયો મથિરાલ્હીયપુત્રો યાકૂબ્ ઉધોગા શિમોન્ યાકૂબો બ્રાતા યિહૂદા એતે સર્વ્યે યત્ર સ્થાને પ્રવસન્તિ તસ્મિન્ ઉપરિતનપ્રકોષ્ઠે પ્રાવિશન્ | 14 પશ્ચાદ્ ઇમે કિચત્ય: સ્ત્રિયશ્ચ યીશો માર્તા મરિયમ્ તસ્ય બ્રાતરશ્ચૈતે સર્વ્યે એકચિત્તીભૂત સતતં વિનયેન વિનયેન પ્રાર્થયન્ત | 15 તસ્મિન્ સમયે તત્ર સ્થાને સાકલ્યેન વિંશત્યધિકશતં શિષ્યા આસન્ | તત: પિતરસ્તેષાં મધ્યે તિષ્ઠન્ ઉક્તવાન્ 16 હે બ્રાતૃગણ

યીશુધારિણાં લોકાનાં પથદર્શકો યો યિહૂદાસ્તસ્મિન્ દાયૂદા પવિત્ર આત્મા
 યાં કથાં કથયામાસ તસ્યાઃ પ્રત્યક્ષીભવનસ્યાવશ્યકત્વમ્ આસીત્ | 17 સ
 જનોડસ્માકં મધ્યવર્તી સન્ અસ્યાઃ સેવાયા અંશમ્ અલભત | 18 તદનન્તરં
 કુકર્માણા લબ્ધં યન્મૂલ્યં તેન ક્ષેત્રમેકં કીતમ્ અપરં તસ્મિન્ અધોમુખે ભૃમૌ
 પતિતે સતિ તસ્યોદરસ્ય વિદીર્ણત્વાત્ સર્વા નાડયો નિરગચ્છન્ | 19 એતાં
 કથાં યિરૂશાલમ્નિવાસિનઃ સર્વે લોકા વિદાન્તિ; તેષાં નિજભાષયા તત્ક્ષેત્રઞ્ચ
 હકલ્દામા, અર્થાત્ રક્તક્ષેત્રમિતિ વિખ્યાતમાસ્તે | 20 અન્યચ્ચ, નિકેતનં
 તદીયન્તુ શુન્યમેવ ભવિષ્યતિ | તસ્ય દૂષ્યે નિવાસાર્થં કોપિ સ્થાસ્યતિ
 નૈવ હિ | અન્ય એવ જનસ્તસ્ય પદં સંપ્રાપ્સ્યતિ ધ્રુવં | ઇત્યં ગીતપુસ્તકે
 લિખિતમાસ્તે | 21 અતો યોહનો મજજનમ્ આરબ્યાસ્માકં સમીપાત્ પ્રભો
 ર્થીશોઃ સ્વર્ગારોહણદિનં યાવત્ સોસ્માકં મધ્યે યાવન્તિ દિનાનિ યાપિતવાન્
 22 તાવન્તિ દિનાનિ યે માનવા અસ્માભિઃ સાદ્ધૃં તિષ્ઠન્તિ તેષામ્ એકેન
 જનેનાસ્માભિઃ સાદ્ધૃં યીશોરુત્યાને સાક્ષિણા ભવિતવ્યં | 23 અતો યસ્ય
 રૂઢિ યુષ્ઠો યં બર્શબ્બેત્યુક્ટ્વાહૂયન્તિ સ યૂષ્ઠ્ મતથિશ્ચ દ્વાવેતૌ પૃથક્ કૃત્વા
 ત ઈશ્વરસ્ય સન્નિધૌ પ્રાર્થ્ય કથિતવન્તઃ, 24 હે સર્વાન્તર્યામિન્ પરમેશ્વર,
 યિહૂદાઃ સેવનપ્રેરિતત્વપદચ્યુતઃ 25 સન્ નિજસ્થાનમ્ અગચ્છત્, તત્પદં
 લબ્ધુમ્ એનયો જનયો મધ્યે ભવતા કોડભિરુચિતસ્તદસ્માન્ દર્શ્યતાં |
 26 તતો ગુટિકાપાટે કૃતે મતથિર્નિરચીયત તસ્માત્ સોન્યેષામ્ એકાદશાનાં
 પ્રરિતાનાં મધ્યે ગણિતોભવત્ |

2 અપરઞ્ચ નિસ્તારોત્સવાત્ પરં પઞ્ચાશત્તમે દિને સમુપસ્થિતે સતિ તે
 સર્વે એકાચિત્તીભૂય સ્થાન એકસ્મિન્ મિલિતા આસન્ | 2 એતસ્મિન્નેવ
 સમયેડકસ્માદ્ આકાશાત્ પ્રચણ્ડાત્યુગ્રવાયોઃ શબ્દવદ્ એકઃ શબ્દ આગત્ય
 યસ્મિન્ ગૃહે ત ઉપાવિશન્ તદ્ ગૃહં સમસ્તં વ્યાખ્નોત્ | 3 તતઃ પરં
 વહ્નિશિખાસ્વરૂપા જિહ્વાઃ પ્રત્યક્ષીભૂય વિભક્તાઃ સત્યઃ પ્રતિજનોર્દ્ધ્વે
 સ્થગિતા અભૂવન્ | 4 તસ્માત્ સર્વે પવિત્રેણાત્મના પરિપૂર્ણાઃ સન્ત
 આત્મા યથા વાચિતવાન્ તદનુસારેણાન્યદેશીયાનાં ભાષા ઉક્તવન્તઃ | 5
 તસ્મિન્ સમયે પૃથિવીસ્થસર્વદેશેભ્યો યિહૂદીયમતાવલમ્બિનો ભક્તલોકા
 યિરૂશાલમિ પ્રાવસન્; 6 તસ્યાઃ કથાયાઃ કિંવદન્ત્યા જાતત્વાત્ સર્વે
 લોકા મિલિત્વા નિજનિજભાષયા શિષ્યાણાં કથાકથનં શ્રુત્વા સમુદ્વિગ્ના

અભવન્ | 7 સર્વએવ વિસ્મયાપન્ના આશ્ચર્યાન્વિતાશ્ચ સન્તઃ પરસ્પરં
 ઉક્તવન્તઃ પશ્યત યે કથાં કથયન્તિ તે સર્વે ગાલીલીયલોકાઃ કિં
 ન ભવન્તિ? 8 તર્હિ વયં પ્રત્યેકશઃ સ્વસ્વજન્મદેશીયભાષાભિઃ કથા
 એતેષાં શૃણુમઃ કિમિદં? 9 પાર્થો-માદી-અરામ્નહરચિમ્દેશનિવાસિમનો
 યિહૂદા-કપ્પદકિયા-પન્ત-આશિયા- 10 ક્ષુગિયા-પમ્કુલિયા-મિસરનિવાસિનઃ
 કુરીણીનિકટવર્તિલૂબીયપ્રદેશનિવાસિનો રોમનગરાદ્ આગતા યિહૂદીયલોકા
 યિહૂદીયમતગ્રાહિણઃ ક્રીતીયા અરાબીયાદયો લોકાશ્ચ યે વયમ્ 11 અસ્માકં
 નિજનિજભાષાભિરેતેષામ્ ઈશ્વરીયમહાકર્મવ્યાખ્યાનં શૃણુમઃ | 12 ઇત્યં
 તે સર્વએવ વિસ્મયાપન્નાઃ સન્દિગ્ધચિત્તાઃ સન્તઃ પરસ્પરમૂયુઃ, અસ્ય
 કો ભાવઃ? 13 અપરે કેચિત્ પરિહસ્ય કથિતવન્ત એતે નવીનદ્રાક્ષારસેન
 મત્તા અભવન્ | 14 તદા પિતર એકાદશાભિર્જનૈઃ સાકં તિષ્ઠન્ તાલ્લોકાન્
 ઉચ્ચૈઃકારમ્ અવદત્, હે યિહૂદીયા હે યિરૂશાલમ્નિવાસિનઃ સર્વે, અવધાનં
 કૃત્વા મદીયવાક્યં બુધ્યધ્વં | 15 ઇદાનીમ્ એકયામાદ્ અધિકા વેલા
 નાસ્તિ તસ્માદ્ યૂયં યદ્ અનુમાથ માનવા ઇમે મધપાનેન મત્તાસ્તન્ |
 16 કિન્તુ યોયેલભવિષ્યદ્વક્રૈતદ્વાક્યમુક્તં યથા, 17 ઈશ્વરઃ કથયામાસ
 યુગાન્તસમયે ત્વહમ્ | વર્ષિષ્યામિ સ્વમાત્માનં સર્વપ્રાણ્યુપરિ ધ્રુવમ્ |
 ભાવિવાક્યં વદિષ્યન્તિ કન્યાઃ પુત્રાશ્ચ વસ્તુતઃ | પ્રત્યાદેશઞ્ચ પ્રાપ્સ્યન્તિ
 યુષ્માકં યુવમાનવાઃ | તથા પ્રાચીનલોકાસ્તુ સ્વપ્નાન્ દ્રક્ષ્યન્તિ નિશ્ચિતં | 18
 વર્ષિષ્યામિ તદાત્માનં દાસદાસીજનોપિરિ | તેનેવ ભાવિવાક્યં તે વદિષ્યન્તિ
 હિ સર્વશઃ | 19 ઉર્દ્ધ્વસ્થે ગગણે ચૈવ નીચસ્થે પૃથિવીતલે | શોણિતાનિ
 બૃહદ્દાનૂન્ ધનધૂમાદિકાનિ ચ | ચિહ્નાનિ દર્શયિષ્યામિ મહાશ્ચર્યક્રિયાસ્તથા |
 20 મહાભયાનકસ્ચૈવ તદ્દિનસ્ય પરેશિતુઃ | પુરાગમાદ્ રવિઃ કૃષ્ણો રક્તશ્ચન્દ્રો
 ભવિષ્યતઃ | 21 કિન્તુ યઃ પરમેશસ્ય નામ્નિ સમ્પ્રાર્થયિષ્યતે | સએવ
 મનુજો નૂનં પરિત્રાતો ભવિષ્યતિ | | 22 અતો હે ઇસ્રાયેલ્વંશીયલોકાઃ
 સર્વે કથાયામેતસ્યામ્ મનો નિઘદ્ધ્વં નાસરતીયો યીશુરીશ્વરસ્ય મનોનીતઃ
 પુમાન્ એતદ્ ઈશ્વરસ્તત્કૃતૈરાશ્ચર્યાદ્ભૂતકર્મભિર્લક્ષણૈશ્ચ યુષ્માકં સાક્ષાદેવ
 પ્રતિપાદિતવાન્ ઇતિ યૂયં જાનીથ | 23 તસ્મિન્ યીશૌ ઈશ્વરસ્ય
 પૂર્વનિશ્ચિતમન્ત્રણાનિરૂપણાનુસારેણ મૃત્યૌ સમર્પિતે સતિ યૂયં તં ધૃત્વા
 દુષ્ટલોકાનાં હસ્તૈઃ કુશે વિધિત્વાહત | 24 કિન્તવીશ્વરસ્તં નિધનસ્ય

બન્ધનાન્મોચયિત્વા ઉદસ્થાપયત્ યતઃ સ મૃત્યુના બદ્ધસ્તિષ્ઠતીતિ ન
 સમ્ભવતિ | 25 એતસ્તિન્ દાયૂદપિ કથિતવાન્ યથા, સર્વ્વદા મમ સાક્ષાત્તં
 સ્થાપય પરમેશ્વરં | સ્થિતે મદ્દક્ષિણે તસ્મિન્ સ્ખલિષ્યામિ ત્વહં નહિ | 26
 આનન્દિષ્યતિ તદ્દેતો મર્મકીનં મનસ્તુ વૈ | આહ્વાદિષ્યતિ જિહ્વાપિ મદીયા તુ
 તથૈવ ચ | પ્રત્યાશયા શરીરન્તુ મદીયં વૈશયિષ્યતે | 27 પરલોકે યતો હેતોસ્ત્વં
 માં નૈવ હિ ત્યક્ષ્યસિ | સ્વકીયં પુણ્યવન્તં ત્વં ક્ષયિતું નૈવ દાસ્યસિ | એવં
 જીવનમાર્ગં ત્વં મામેવ દર્શયિષ્યસિ | (Madēs ૭86) 28 સ્વસમ્મુખે ય આનન્દો
 દક્ષિણે સ્વસ્ય યત્ સુખં | અનન્તં તેન માં પૂર્ણં કરિષ્યસિ ન સંશયઃ | |
 29 હે ભ્રાતરોડસ્માકં તસ્ય પૂર્વ્વપુરુષસ્ય દાયૂદઃ કથાં સ્પષ્ટં કથયિતું મામ્
 અનુમન્યધ્વં, સ પ્રાર્ણાન્ ત્યક્ત્વા શ્મશાને સ્થાપિતોભવદ્ અધાપિ તત્
 શ્મશાનમ્ અસ્માકં સન્નિઘૌ વિધતે | 30 ફલતો લૌકિકભાવેન દાયૂદો
 વંશે ખ્રીષ્ટં જન્મ ગ્રાહયિત્વા તસ્યૈવ સિંહાસને સમુવેષ્ટું તમુત્થાપયિષ્યતિ
 પરમેશ્વરઃ શપથં કૃત્વા દાયૂદઃ સમીપ ઇમમ્ અઙ્ગીકારં કૃતવાન્ 31 ઇતિ
 જ્ઞાત્વા દાયૂદ ભવિષ્યદ્વાદી સન્ ભવિષ્યત્કાલીયજ્ઞાનેન ખ્રીષ્ટોત્થાને કથામિમાં
 કથયામાસ યથા તસ્યાત્મા પરલોકે ન ત્યક્ષ્યતે તસ્ય શરીરઞ્ચ ન ક્ષેષ્યતિ;
 (Madēs ૭86) 32 અતઃ પરમેશ્વર એનં યીશું શ્મશાનાદ્ ઉદસ્થાપયત્ તત્ર વયં
 સર્વ્વે સાક્ષિણ આસ્મહે | 33 સ ઇશ્વરસ્ય દક્ષિણકરેણોન્નતિં પ્રાપ્ય પવિત્ર
 આત્મિન પિતા યમઙ્ગીકારં કૃતવાન્ તસ્ય ફલં પ્રાપ્ય યત્ પશ્યથ શૃણુથ ચ
 તદવર્ષત્ | 34 યતો દાયૂદ સ્વર્ગં નારુરોહ કિન્તુ સ્વયમ્ ઇમાં કથામ્ અકથયદ્
 યથા, મમ પ્રભુમિદં વાક્યમવદત્ પરમેશ્વરઃ | 35 તવ શત્રૂનહં યાવત્ પાદપીઠં
 કરોમિ ન | તાવત્ કાલં મદીયે ત્વં દક્ષવાર્શ્વ ઉપાવિશ | 36 અતો યં યીશું યૂયં
 કુશેડહત પરમેશ્વરસ્તં પ્રભુત્વાભિષિક્તત્વપદે ન્યયુંક્રતેતિ ઇસ્રાયેલીયા લોકા
 નિશ્ચિતં જાનન્તુ | 37 એતાદૃશીં કથાં શ્રુત્વા તેષાં હૃદયાનાં વિદીર્ણત્વાત્ તે
 પિતરાય તદન્યપ્રેરિતેભ્યશ્ચ કથિતવન્તઃ, હે ભ્રાતૃગણ વયં કિં કરિષ્યામઃ? 38
 તતઃ પિતરઃ પ્રત્યવદદ્ યૂયં સર્વ્વે સ્વં સ્વં મનઃ પરિવર્તયધ્વં તથા પાપમોચનાર્થં
 યીશુખ્રીષ્ટસ્ય નામ્ના મજિજતાશ્ચ ભવત, તસ્માદ્ દાનરૂપં પરિત્રમ્ આત્માનં
 લપ્સ્યથ | 39 યતો યુષ્માકં યુષ્મત્સન્તાનાનાઞ્ચ દૂરસ્થસર્વ્વલોકાનાઞ્ચ
 નિમિત્તમ્ અર્થાદ્ અસ્માકં પ્રભુઃ પરમેશ્વરો યાવતો લાકાન્ આહ્વાસ્યતિ તેષાં
 સર્વ્વેષાં નિમિત્તમ્ અયમઙ્ગીકાર આસ્તે | 40 એતદન્યાભિ ભૂકુકથાભિઃ

प्रमाणं दत्वाकथयत् अतेत्यो विपथगामित्यो वर्तमानलोकेत्यः स्वान्
 रक्षत। 41 ततः परं ये सान्दास्तां कथाम् अगृह्णन् ते भञ्जिता अभवन्।
 तस्मिन् दिवसे प्रायेण त्रीणि सहास्राणि लोकास्तेषां सपक्षाः सन्तः 42
 प्रेरितानाम् उपदेशे सङ्गतौ पूषभञ्जने प्रार्थनासु य मनःसंयोगं कृत्वातिष्ठन्।
 43 प्रेरितैर्नानाप्रकारलक्षणेषु महाश्रर्यकर्मसु य दशितेषु सर्व्वलोकानां
 भयमुपस्थितं। 44 विश्वासकारिणः सर्व्व य सहा तिष्ठन्तः। स्वेषां
 सर्व्वाः सम्पत्तीः साधारण्येन स्थापयित्वाभुञ्जत। 45 झलतो गृहाणि
 द्रव्याणि य सर्व्वाणि विक्रीय सर्व्वेषां स्वस्वप्रयोजनानुसारेण विभज्य
 सर्व्वेत्योऽददन्। 46 सर्व्व ऐक्यितीभूय दिने दिने मन्दिरे सन्तिष्ठमाना
 गृहे गृहे य पूषानभञ्जन्त एश्वरस्य धन्यवाहं कुर्वन्तो लोकैः समादृताः
 परमानन्देन सरलान्तःकरणेन भोजनं पानञ्चकुर्वन्। 47 परमेश्वरो दिने
 दिने परित्राणामाजनेर्भाण्डलीम् अवर्द्धयत्।

3 तृतीययामवेलायां सत्यां प्रार्थनायाः समये पितरयोऽनौ सम्भूय मन्दिरं
 गच्छतः। 2 तस्मिन्नेव समये मन्दिरप्रवेशकानां समीपे भिक्षारणार्थं यं
 जन्मभञ्जमानुषं लोका मन्दिरस्य सुन्दरनाम्नि द्वारे प्रतिदिनम् अस्थापयन्
 तं वदन्तस्तद्वारं आनयन्। 3 तदा पितरयोऽनौ मन्दिरं प्रवेष्टुम् उद्यतौ
 विलोक्य स भञ्जस्तौ किञ्चिद् भिक्षितवान्। 4 तस्माद् योऽना सङ्घितः
 पितरस्तम् अनन्यदृष्ट्या निरीक्ष्य प्रोक्तवान् आवां प्रति दृष्टिं कुरु। 5 ततः
 स किञ्चित् प्राप्त्याशया तौ प्रति दृष्टिं कृतवान्। 6 तदा पितरो गदितवान् मम
 निकटे स्वार्णश्यादि किमपि नास्ति किन्तु यदास्ते तद् ददामि नासरतीयस्य
 यीशुभ्रीष्टस्य नाम्ना त्वमुत्थाय गमनागमने कुरु। 7 ततः परं स तस्य
 दक्षिणकरं धृत्वा तम् उदतोलयत्; तेन तत्क्षणात् तस्य जनस्य पादगुल्फयोः
 सभलत्वात् स उल्लभ्य प्रोत्थाय गमनागमने ऽकरोत्। 8 ततो गमनागमने
 कुर्वन् उल्लभ्य एश्वरं धन्यं वदन् ताभ्यां सार्द्धं मन्दिरं प्राविशत्। 9 ततः
 सर्व्वे लोकास्तं गमनागमने कुर्वन्तम् एश्वरं धन्यं वदन्तश्च विलोक्य 10
 मन्दिरस्य सुन्दरे द्वारे य उपविश्य भिक्षितवान् सभेवायम् एति ज्ञात्वा
 तं प्रति तथा घटनया यमत्कृता विस्मयापन्नाभवावन्। 11 यः भञ्जः
 स्वस्थोभवत् तेन पितरयोऽनोः करयोर्धृतयोः सतोः सर्व्वे लोका सन्निधिम्
 आगच्छन्। 12 तद् दृष्ट्वा पितरस्तेत्योऽकथयत्, हे एसायेलीयलोका

યૂયં કુતો ડનેનાશ્ચર્ય્યં મન્યધ્વે? આવાં નિજશક્ત્યા યદ્વા નિજપુણ્યેન
 ખજ્જમનુષ્યમેનં ગમિતવન્તાવિતિ ચિન્તયિત્વા આવાં પ્રતિ કુતોડનન્યદૃષ્ટિ
 કુરુથ? 13 યં યીશું યૂયં પરકરેષુ સમાર્પયત તતો યં પીલાતો મોચયિતુમ્
 એચ્છત્ તથાપિ યૂયં તસ્ય સાક્ષાન્ નાજ્ઞીકૃતવન્ત ઇબ્રાહીમ ઇસ્હાકો
 યાકૂબશ્ચેશ્વરોડર્થાદ્ અસ્માકં પૂર્વપુરુષાણામ્ ઇશ્વરઃ સ્વપુત્રસ્ય તસ્ય
 યીશો મંહિમાનં પ્રાકાશયત્| 14 કિન્તુ યૂયં તં પવિત્રં ધાર્મિકં પુમાંસં
 નાજ્ઞીકૃત્ય હત્યાકારિણમેકં સ્વેભ્યો દાતુમ્ અચાયધ્વં| 15 પશ્ચાત્ તં
 જીવનસ્યાધિપતિમ્ અહત કિન્ત્વીશ્વરઃ શ્મશાનાત્ તમ્ ઉદસ્થાપયત તત્ર
 વયં સાક્ષિણ આસ્મહે| 16 ઇમં યં માનુષં યૂયં પશ્યથ પરિચિનુથ ય સ તસ્ય
 નામ્નિ વિશ્વાસકરણાત્ ચલનશક્તિં લબ્ધવાન્ તસ્મિન્ તસ્ય યો વિશ્વાસઃ
 સ તં યુષ્માકં સર્વેષાં સાક્ષાત્ સમ્પૂર્ણરૂપેણ સ્વસ્થમ્ અકાર્ષીત્| 17 હે
 બ્રાતરો યૂયં યુષ્માકમ્ અધિપતયશ્ચ અજ્ઞાત્વા કર્માણ્યેતાનિ કૃતવન્ત ઇદાનીં
 મમૈષ બોધો જાયતે| 18 કિન્ત્વીશ્વરઃ ખ્રીષ્ટસ્ય દુઃખભોગે ભવિષ્યદ્વાદિનાં
 મુખેભ્યો યાં યાં કથાં પૂર્વમકથયત્ તાઃ કથા ઇત્યં સિદ્ધા અકરોત્|
 19 અતઃ સ્વેષાં પાપમોચનાર્થં ખેદં કૃત્વા મનાંસિ પરિવર્તયધ્વં, તસ્માદ્
 ઇશ્વરાત્ સાન્ત્વનાપ્રાપ્તેઃ સમય ઉપસ્થાસ્યતિ; 20 પુનશ્ચ પૂર્વકાલમ્
 આરભ્ય પ્રચારિતો યો યીશુખ્રીષ્ટસ્તમ્ ઇશ્વરો યુષ્માન્ પ્રતિ પ્રેષયિષ્યતિ|
 21 કિન્તુ જગતઃ સૃષ્ટિમારભ્ય ઇશ્વરો નિજપવિત્રભવિષ્યદ્વાદિગણોન
 યથા કથિતવાન્ તદનુસારેણ સર્વેષાં કાર્ય્યાણાં સિદ્ધિપર્યન્તં તેન સ્વર્ગે
 વાસઃ કર્તવ્યઃ| (aiōn g165) 22 યુષ્માકં પ્રભુઃ પરમેશ્વરો યુષ્માકં
 બ્રાતૃગણમધ્યાત્ મત્સદૃશં ભવિષ્યદ્વક્તારમ્ ઉત્પાદયિષ્યતિ, તતઃ સ યત્
 કિન્ચિત્ કથયિષ્યતિ તત્ર યૂયં મનાંસિ નિધદ્ધ્વં| 23 કિન્તુ યઃ કશ્ચિત્
 પ્રાણી તસ્ય ભવિષ્યદ્વાદિનઃ કથાં ન ગ્રહીષ્યતિ સ નિજલોકાનાં મધ્યાદ્
 ઉચ્છેત્સ્યતે," ઇમાં કથામ્ અસ્માકં પૂર્વપુરુષેભ્યઃ કેવલો મૂસાઃ કથયામાસ
 ઇતિ નહિ, 24 શિમૂયેલભવિષ્યદ્વાદિનમ્ આરભ્ય યાવન્તો ભવિષ્યદ્વાક્યમ્
 અકથયન્ તે સર્વએવ સમયસ્યૈતસ્ય કથામ્ અકથયન્| 25 યૂયમપિ તેષાં
 ભવિષ્યદ્વાદિનાં સન્તાનાઃ, "તવ વંશોદ્ભવપુંસા સર્વદેશીયા લોકા આશિષં
 પ્રાપ્તા ભવિષ્યન્તિ", ઇબ્રાહીમે કથામેતાં કથયિત્વા ઇશ્વરોસ્માકં પૂર્વપુરુષૈઃ
 સાદ્ધ્વં યં નિયમં સ્થિરીકૃતવાન્ તસ્ય નિયમસ્યાધિકારિણોપિ યૂયં ભવથ|

26 अत एश्वरो निजपुत्रं यीशुम् उत्थाप्य युष्माकं सर्वेषां स्वस्वपापात् परावर्त्य युष्मद्यम् आशिषं दातुं प्रथमतस्तं युष्माकं निकटे प्रेषितवान्।

4 यस्मिन् समये पितरयोऽनौ लोकान् उपदिशतस्तस्मिन् समये याजका मन्दिरेस्य सेनापतयः सिङ्कीगाराश्च 2 तयोर् उपदेशकारो श्रीष्टस्योत्थानम् उपलक्ष्य सर्वेषां मृतानाम् उत्थानप्रस्तावे य व्यग्राः सन्तस्तावुपागमन्। 3 तौ धृत्वा दिनावसानकारणात् परदिनपर्यन्तं रुद्ध्वा स्थापितवन्तः। 4 तथापि ये लोकास्तयोरुपदेशम् अशृण्वन् तेषां प्रायेण पञ्चसहस्राणि जना व्यश्वसन्। 5 परेऽहनि अधिपतयः प्राचीना अध्यापकाश्च हानननामा महायाजकः 6 कियङ्गा योऽन् सिङ्कर एत्याद्यो महायाजकस्य ज्ञातयः सर्वे धिःशालमनगरे मिलिताः। 7 अनन्तरं प्रेरितौ मध्ये स्थापयित्वापृच्छन् युवां कया शक्तया वा केन नाम्ना कर्माण्येतानि कुरुथः? 8 तदा पितरः पवित्रेणात्मना परिपूर्णाः सन् प्रत्यवादीत्, हे लोकानाम् अधिपतिगण हे एसायेलीयप्राचीनाः, 9 अेतस्य दुर्बलमानुषस्य हितं यत् कर्माकियत्, अर्थात्, स येन प्रकारेण स्वस्थोभवत् तय्येद् अधावां पृच्छथ, 10 तर्हि सर्वे एसायेलीयलोका यूयं जानीत नासरतीयो यो यीशुप्रीष्टः कुशे युष्माभिरविध्यत यश्चेतरेण श्मशानाद् उत्थापितः, तस्य नाम्ना जनोयं स्वस्थः सन् युष्माकं सम्भुजे प्रोत्तिष्ठति। 11 नियेतृभि र्युष्माभिरयं यः प्रस्तरोऽवज्ञातोऽभवत् स प्रधानकोणस्य प्रस्तरोऽभवत्। 12 तद्दिनादपरात् कस्मादपि परित्राणं भवितुं न शक्नोति, येन त्राणं प्रायेत भूमार्ऽलस्यलोकानां मध्ये तादृशं किमपि नाम नास्ति। 13 तदा पितरयोऽनोरेतादृशीम् अक्षेभतां दृष्ट्वा तावदिद्वांसौ नीयलोकाविति बुद्ध्वा आश्चर्यम् अमन्यन्त तौ य यीशोः सङ्गिनौ जाताविति ज्ञातुम् अशक्नुवन्। 14 किन्तु ताभ्यां सार्द्धं तं स्वस्थमानुषं तिष्ठन्तं दृष्ट्वा ते कामप्यपराम् आपत्तिं कर्तुं नाशक्नुन्। 15 तदा ते सभातः स्थानान्तरं गन्तुं तान् आज्ञाप्य स्वयं परस्परम् एति मन्त्राणामकुर्वन् 16 तौ मानवौ प्रति किं कर्तव्यं? तावेकं प्रसिद्धम् आश्चर्यं कर्म कृतवन्तौ तद् धिःशालमनिवासिनां सर्वेषां लोकानां समीपे प्राकाशत तस्य वयमपह्नोतुं न शक्नुमः। 17 किन्तु लोकानां मध्यम् अेतद् यथा न व्याप्नोति तदर्थं तौ भयं प्रदर्श्य तेन नाम्ना कमपि मनुष्यं नोपदिशतम् एति दृढं निषेधामः। 18 ततस्ते प्रेरितावाहूय अेतदाज्ञापयन्

ઇતઃ પરં યીશો નર્મિના કદાપિ કામપિ કથાં મા કથયતં કિમપિ નોપદિશઞ્ચ |
 19 તતઃ પિતરયોહનો પ્રત્યવદતામ્ ઈશ્વરસ્યાજ્ઞાગ્રહણં વા યુષ્માકમ્
 આજ્ઞાગ્રહણમ્ એતયો મધ્યે ઈશ્વરસ્ય ગોચરે કિં વિહિતં? યૂયં તસ્ય
 વિવેચનાં કુરુત | 20 વયં યદ્ અપશ્યામ યદશૃણુમ ચ તન્ન પ્રચારયિષ્યામ
 એતત્ કદાપિ ભવિતું ન શક્નોતિ | 21 યદઘટત તદ્ દૃષ્ટા સર્વે લોકા ઈશ્વરસ્ય
 ગુણાન્ અન્વવદન્ તસ્માત્ લોકભયાત્ તૌ દણ્ડયિતું કમપ્યુપાયં ન પ્રાપ્ય તે
 પુનરપિ તર્જયિત્વા તાવત્યજન્ | 22 યસ્ય માનુષસ્યૈતત્ સ્વાસ્થ્યકરણમ્
 આશ્ચર્ય્ય કર્માક્રિયત તસ્ય વચશ્રત્વારિંશદ્વત્સરા વ્યતીતાઃ | 23 તતઃ પરં
 તૌ વિસૃષ્ટૌ સન્તૌ સ્વસક્તિનાં સન્નિધિં ગત્વા પ્રધાનયાજકૈઃ પ્રાચીનલોકૈશ્ચ
 પ્રોકતાઃ સર્વાઃ કથા જ્ઞાપિતવન્તૌ | 24 તચ્છૃત્વા સર્વે એકચિત્તીભૂય
 ઈશ્વરમુદ્દિશ્ય પ્રોચ્ચૈરેતત્ પ્રાર્થયન્ત, હે પ્રભો ગગણપૃથિવીપયોધીનાં
 તેષુ ચ યદઘ્ આસ્તે તેષાં સ્ત્રેશ્વરસ્ત્વં | 25 ત્વં નિજસેવકેન દાયૂદા
 વાક્યમિદમ્ ઉવચિથ, મનુષ્યા અન્યદેશીયાઃ કુર્વન્તિ કલહં કુતઃ | લોકાઃ
 સર્વે કિમર્થં વા ચિન્તાં કુર્વન્તિ નિષ્કલાં | 26 પરમેશસ્ય તેનૈવાભિષિક્તસ્ય
 જનસ્ય ચ | વિરુદ્ધમભિતિષ્ણન્તિ પૃથિવ્યાઃ પતયઃ કુતઃ | | 27 ફલતસ્તવ
 હસ્તેન મન્ત્રણયા ચ પૂર્વ્ય યદત્ સ્થિરીકૃતં તદ્ યથા સિદ્ધં ભવતિ તદર્થં
 ત્વં યમ્ અધિષિક્તવાન્ સ એવ પવિત્રો યીશુસ્તસ્ય પ્રાતિકૂલ્યેન હેરોદ્
 પન્તીયપીલાતો 28 ડન્યદેશીયલોકા ઇસ્રાયેલ્લોકાશ્ચ સર્વે એતે સભાયામ્
 અતિષ્ઠન્ | 29 હે પરમેશ્વર અધુના તેષાં તર્જનં ગર્જનઞ્ચ શૃણુઃ 30 તથા
 સ્વાસ્થ્યકરણકર્માણા તવ બાહુબલપ્રકાશપૂર્વકં તવ સેવકાન્ નિર્ભયેન તવ
 વાક્યં પ્રચારયિતું તવ પવિત્રપુત્રસ્ય યીશો નર્મિના આશ્ચર્ય્યાણ્યસમ્ભવાનિ
 ચ કર્માણિ કર્તુઞ્ચાજ્ઞાપય | 31 ઇત્યં પ્રાર્થનયા યત્ર સ્થાને તે સભાયામ્
 આસન્ તત્ સ્થાનં પ્રાકમ્પતઃ; તતઃ સર્વે પવિત્રેણાત્મના પરિપૂર્ણાઃ સન્ત
 ઈશ્વરસ્ય કથામ્ અક્ષોભેણ પ્રાચારયન્ | 32 અપરઞ્ચ પ્રત્યયકારિલોકસમૂહા
 એકમનસ એકચિત્તીભૂય સ્થિતાઃ | તેષાં કેપિ નિજસમ્પત્તિં સ્વીયાં નાજાનન્
 કિન્તુ તેષાં સર્વાઃ સમ્પત્તયઃ સાધારણ્યેન સ્થિતાઃ | 33 અન્યચ્ચ પ્રેરિતા
 મહાશક્તિપ્રકાશપૂર્વકં પ્રભો રીશોરુત્થાને સાક્ષ્યમ્ અદદુઃ, તેષુ સર્વેષુ
 મહાનુગ્રહોડભવચ્ચ | 34 તેષાં મધ્યે કસ્યાપિ દ્રવ્યન્યૂનતા નાભવદ્ યતસ્તેષાં
 ગૃહભૂમ્યાધા યાઃ સમ્પત્તય આસન્ તા વિક્રીય 35 તન્મૂલ્યમાનીય પ્રેરિતાનાં

यरणेषु तैः स्थापितं; ततः प्रत्येकशः प्रयोजनानुसारेण दत्तमभवत् | 36
विशेषतः कुप्रोपद्वीपीयो योसिनामको लेविवंशजात अको जनो भूम्यधिकारी,
यं प्रेरिता बाएब्बा अर्थात् सान्त्वनादायकं एत्युक्त्वा समाहूयन्, 37 स
जनो निजभूमिं विक्रीय तन्मूल्यमानीय प्रेरितानां यरणेषु स्थापितवान् |

5 तदा अनानियनामक अको जनो यस्य भार्याया नाम सङ्गिरा स
स्वाधिकारं विक्रीय 2 स्वभार्यां ज्ञापयित्वा तन्मूल्यस्यैकांशं सङ्गोप्य
स्थापयित्वा तदन्यांशमात्रमानीय प्रेरितानां यरणेषु समर्पितवान् | 3
तस्मात् पितरोकथयत् हे अनानिय भूमे भूल्यं किञ्चित् सङ्गोप्य स्थापयितुं
पवित्रस्यात्मनः सन्निधौ मृषावाक्यं कथयितुञ्च शैतान् कुतस्तवान्तःकरणे
प्रवृत्तिमजनयत्? 4 सा भूमि र्यदा तव हस्तगता तदा किं तव स्वीया
नासीत्? तर्हि स्वान्तःकरणे कुत अेतादृशी कुकल्पना त्वया कृता? त्वं
केवलमनुष्यस्य निकटे मृषावाक्यं नावादीः किन्त्वीश्वरस्य निकटेऽपि | 5
अेतां कथां श्रुत्वैव सोऽनानियो भूमौ पतन् प्राणान् अत्यजत्, तद्धृतान्तं
यावन्तो लोका अशृण्वन् तेषां सर्वेषां मडाभयम् अजायत् | 6 तदा
युवलोकास्तं वस्त्रेणाच्छाद्य बहिर् नीत्वा श्मशानेऽस्थापयन् | 7 ततः
प्रहरैकानन्तरं किं वृत्तं तन्नावगत्य तस्य भार्यापि तत्र समुपस्थिता | 8
ततः पितरस्ताम् अपृच्छत्, युवाभ्याम् अेतावन्मुद्राभ्यो भूमिं विंकीता
न वा? अेतत्वं वद; तदा सा प्रत्यवादीत् सत्यम् अेतावद्भ्यो मुद्राभ्य
अेव | 9 ततः पितरोकथयत् युवां कथं परमेश्वरस्यात्मानं परीक्षितुम्
अेकमन्त्राणावभवतां? पश्य ये तव पतिं श्मशाने स्थापितवन्तस्ते द्वारस्य
समीपे समुपतिष्ठन्ति त्वामपि बहिर्नेष्यन्ति | 10 ततः सापि तस्य
यरणसन्निधौ पतित्वा प्राणान् अत्याक्षीत् | पश्चात् ते युवानोऽभ्यन्तरम्
आगत्य तामपि मृतां दृष्ट्वा बहिर् नीत्वा तस्याः पत्युः पार्श्वे श्मशाने
स्थापितवन्तः | 11 तस्मात् माण्डव्याः सर्वे लोका अन्यलोकाश्च तां
वार्तां श्रुत्वा साध्वसं गताः | 12 ततः परं प्रेरितानां हस्तैर् लोकाणां मध्ये
बह्वाश्रयार्थाय द्रुतानि कर्माण्यकियन्तः; तदा शिष्याः सर्वे अेकचित्तीभूय
सुदेमानो ऽलिन्दे सम्भूयासन् | 13 तेषां सङ्घान्तर्गो भवितुं कोपि प्रगल्भतां
नागमत् किन्तु लोकास्तान् समाद्रियन्त | 14 स्त्रियः पुरुषाश्च बहवो लोका
विश्वास्य प्रबुं शरणमापन्नाः | 15 पितरस्य गमनागमनाभ्यां केनापि

પ્રકારેણ તસ્ય છાયા કસ્મિંશ્રિજજને લગિષ્યતીત્યાશયા લોકા રોગિણઃ
 શિવિકયા ખદ્વયા ચાનીય પથિ પથિ સ્થાપિતવન્તઃ | 16 ચતુર્દિકસ્થનગરેભ્યો
 બહવો લોકાઃ સમભૂય રોગિણોડપવિત્રભુતગ્રસ્તાંશ્ર ચિરૂશાલમમ્ આનયન્
 તતઃ સર્વે સ્વસ્થા અક્રિયન્ત | 17 અનન્તરં મહાયાજકઃ સિદ્ધકિનાં
 મતગ્રાહિણસ્તેષાં સહયરાશ્ર 18 મહાક્રોધાન્વિતાઃ સન્તઃ પ્રેરિતાન્ ધૃત્વા
 નીયલોકાનાં કારાયાં બદ્ધ્વા સ્થાપિતવન્તઃ | 19 કિન્તુ રાત્રૌ પરમેશ્વરસ્ય
 દૂતઃ કારાયા દ્વારં મોચયિત્વા તાન્ બહિરાનીયાકથયત્, 20 યૂયં ગત્વા
 મન્દિરે દાડાયમાનાઃ સન્તો લોકાન્ પ્રતીમાં જીવનદાયિકાં સર્વાં કથાં
 પ્રચારયત | 21 ઇતિ શ્રુત્વા તે પ્રત્યૂષે મન્દિર ઉપસ્થાય ઉપદિષ્ટવન્તઃ | તદા
 સહયરગણેન સહિતો મહાયાજક આગત્ય મન્ત્રિગણમ્ ઇસ્રાયેલ્વંશસ્ય
 સર્વાન્ રાજસભાસદઃ સભાસ્થાન્ કૃત્વા કારાયાસ્તાન્ આપયિતું પદાતિગણં
 પ્રેરિતવાન્ | 22 તતસ્તે ગત્વા કારાયાં તાન્ અપ્રાપ્ય પ્રત્યાગત્ય ઇતિ વાર્તામ્
 અવાદિષુઃ, 23 વયં તત્ર ગત્વા નિર્વિઘ્નં કારાયા દ્વારં રુદ્ધં રક્ષકાંશ્ર દ્વારસ્ય
 બહિર્દાડાયમાનાન્ અદર્શામિ એવ કિન્તુ દ્વારં મોચયિત્વા તન્મધ્યે કમપિ
 દ્રષ્ટું ન પ્રાપ્તાઃ | 24 એતાં કથાં શ્રુત્વા મહાયાજકો મન્દિરસ્ય સેનાપતિઃ
 પ્રધાનયાજકાશ્ર, ઇત પરં કિમપરં ભવિષ્યતીતિ ચિન્તયિત્વા સન્દિગ્ધયિત્તા
 અભવન્ | 25 એતસ્મિન્નેવ સમયે કશ્ચિત્ જન આગત્ય વાર્તામિતામ્
 અવદત્ પશ્યત યૂયં ચાન્ માનવાન્ કારાયામ્ અસ્થાપયત તે મન્દિરે તિષ્ઠન્તો
 લોકાન્ ઉપદિશન્તિ | 26 તદા મન્દિરસ્ય સેનાપતિઃ પદાતયશ્ર તત્ર ગત્વા
 ચેલ્લોકાઃ પાષાણાન્ નિક્ષિપ્યાસ્માન્ મારયન્તીતિ ભિયા વિનત્યાચારં
 તાન્ આનયન્ | 27 તે મહાસભાયા મધ્યે તાન્ અસ્થાપયન્ તતઃ પરં
 મહાયાજકસ્તાન્ અપૃચ્છત્, 28 અનેન નામ્ના સમુપદેષ્ટું વયં કિં દૃઢં ન
 ન્યષેધામ? તથાપિ પશ્યત યૂયં સ્વેષાં તેનોપદેશેને ચિરૂશાલમં પરિપૂર્ણં કૃત્વા
 તસ્ય જનસ્ય રક્તપાતજનિતાપરાધમ્ અસ્માન્ પ્રત્યાનેતું ચેષ્ઠ્યે | 29 તતઃ
 પિતરોન્યપ્રેરિતાશ્ર પ્રત્યવદન્ માનુષસ્યાજ્ઞાગ્રહણાદ્ ઇશ્વરસ્યાજ્ઞાગ્રહણમ્
 અસ્માકમુચિતમ્ | 30 યં ચીશું યૂયં કુશે વેધિત્વાહત તમ્ અસ્માકં પૈતૃક
 ઇશ્વર ઉત્થાપ્ય 31 ઇસ્રાયેલ્વંશાનાં મનઃપરિવર્તનં પાપક્ષમાઞ્ચ કર્તું રાજાનં
 પરિત્રાતારઞ્ચ કૃત્વા સ્વદક્ષિણપાશ્વે તસ્યાન્નતિમ્ અકરોત્ | 32 એતસ્મિન્
 વયમપિ સાક્ષિણ આસ્મહે, તત્ કેવલં નહિ, ઇશ્વર આજ્ઞાગ્રાહિભ્યો યં

પવિત્રમ્ આત્મનં દત્તવાન્ સોપિ સાક્ષ્યસ્તિ | 33 એતદ્વાક્યે શ્રુતે તેષાં
 હૃદયાનિ વિદ્વાન્યભવન્ તતસ્તે તાન્ હન્તું મન્ત્રિતવન્તઃ | 34 એતસ્મિન્નેવ
 સમયે તત્સભાસ્થાનાં સર્વલોકાનાં મધ્યે સુખ્યાતો ગમિલીયેભ્નામક એકો
 જનો વ્યવસ્થાપકઃ ક્ષિરુશિલોક ઉત્થાય પ્રેરિતાન્ ક્ષણાર્થં સ્થાનાન્તરં
 ગન્તુમ્ આદિશ્ય કથિતવાન્, 35 હે ઇસ્રાયેલ્લવંશીયાઃ સર્વે યૂયમ્ એતાન્
 માનુષાન્ પ્રતિ યત્ કર્તુમ્ ઉદ્યતાસ્તસ્મિન્ સાવધાના ભવત | 36 ઇતઃ
 પૂર્વં થૂદાનામૈકો જન ઉપસ્થાય સ્વં કમપિ મહાપુરુષમ્ અવદત્, તતઃ
 પ્રાયેણ યતુઃશતલોકાસ્તસ્ય મતગ્રાહિણોભવન્ પશ્ચાત્ સ હતોભવત્
 તસ્યાજ્ઞાગ્રાહિણો યાવન્તો લોકાસ્તે સર્વે વિકીર્ણાઃ સન્તો ડકૃતકાર્ય્યા
 અભવન્ | 37 તસ્માજ્જનાત્ પરં નામલેખનસમયે ગાલીલીયથિહૂદાનામૈકો
 જન ઉપસ્થાય બહૂલ્લોકાન્ સ્વમતં ગ્રાહીતવાન્ તતઃ સોપિ વ્યનશ્યત્
 તસ્યાજ્ઞાગ્રાહિણો યાવન્તો લોકા આસન્ તે સર્વે વિકીર્ણા અભવન્ |
 38 અધુના વદામિ, યૂયમ્ એતાન્ મનુષ્યાન્ પ્રતિ કિમપિ ન કૃત્વા ક્ષાન્તા
 ભવત, યત એષ સકુલ્પ એતત્ કર્મ ય યદિ મનુષ્યાદભવત્ તર્હિ વિક્લં
 ભવિષ્યતિ | 39 યદીશ્વરાદભવત્ તર્હિ યૂયં તસ્યાન્યથા કર્તું ન શક્ષ્યથ,
 વરમ્ ઇશ્વરરોધકા ભવિષ્યથ | 40 તદા તસ્ય મન્ત્રણાં સ્વીકૃત્ય તે પ્રેરિતાન્
 આહૂય પ્રહૃત્ય યીશો નામ્ના કામપિ કથાં કથયિતું નિષિધ્ય વ્યસર્જન્ |
 41 કિન્તુ તસ્ય નામાર્થં વયં લજ્જાભોગસ્ય યોગ્યત્વેન ગણિતા ઇત્યત્ર તે
 સાનન્દાઃ સન્તઃ સભાસ્થાનાં સાક્ષાદ્ અગચ્છન્ | 42 તતઃ પરં પ્રતિદિનં મન્દિરે
 ગૃહે ગૃહે ચાવિશ્રામમ્ ઉપદિશ્ય યીશુશ્રીષ્ટસ્ય સુસંવાદં પ્રચારિતવન્તઃ |

6 તસ્મિન્ સમયે શિષ્યાણાં બાહુલ્યાત્ પ્રાત્યહિકદાનસ્ય વિશ્રાણનૈ
 ભિન્નદેશીયાનાં વિધવાસ્ત્રીગણ ઉપેક્ષિતે સતિ ઇબ્રીયલોકૈઃ સહાન્યદેશીયાનાં
 વિવાદ ઉપાતિષ્ઠત્ | 2 તદા દ્વાદશપ્રેરિતાઃ સર્વાન્ શિષ્યાન્ સંગૃહ્યાકથયન્
 ઇશ્વરસ્ય કથાપ્રચારં પરિત્યજ્ય ભોજનગવેષણમ્ અસ્માકમ્ ઉચિતં
 નહિ | 3 અતો હે ભ્રાતૃગણ વયમ્ એતત્કર્માણો ભારં ચેભ્યો દાતું
 શક્નુમ એતાદૃશાન્ સુખ્યાત્યાપન્નાન્ પવિત્રેણાત્મના જ્ઞાનેન ય પૂર્ણાન્
 સપ્તજનાન્ યૂયં સ્વેષાં મધ્યે મનોનીતાન્ કુરુત, 4 કિન્તુ વયં પ્રાર્થનાયાં
 કથાપ્રચારકર્મણિ ય નિત્યપ્રવૃત્તાઃ સ્થાસ્યામઃ | 5 એતસ્યાં કથાયાં સર્વે
 લોકાઃ સન્તુષ્ટાઃ સન્તઃ સ્વેષાં મધ્યાત્ સ્તિફાનઃ ક્ષિલિપઃ પ્રખરો નિકાનોર્

तीमन् पर्मिणा यिडूढिमतग्राही-आन्तियभियानगरीयो निकला अेतान्
परमभक्तान् पवित्रेणात्मना परिपूर्णां सप्त जनान् 6 प्रेरितानां समक्षम्
आनयन्, ततस्ते प्रार्थनां कृत्वा तेषां शिरःसु हस्तान् आर्पयन्। 7 अपरञ्च
एश्वरस्य कथा देशं व्याप्नोत् विशेषतो यिडूशालमि नगरे शिष्याणां संख्या
प्रभूतः। तेषां वद्धत याजकानां मध्येपि बलवः प्रीष्टमतग्राहणोऽभवन्।
8 स्तिङ्गानो विश्वासेन पराक्रमेण य परिपूर्णाः सन् लोकानां मध्ये
बहुविधम् अद्भुतम् आश्चर्यं कर्माकरोत्। 9 तेन लिबर्त्तिनीयनाम्ना
विष्यातसङ्घस्य कतिपयजनाः कुरीणीयसिक्न्दरीय-किलिकीयाशीयादेशीयाः
कियन्तो जनाश्रयोत्थाय स्तिङ्गानेन सार्द्धं व्यवदन्त। 10 किन्तु स्तिङ्गानो
ज्ञानेन पवित्रेणात्मना य एदृशीं कथां कथितवान् यस्यास्ते आपत्तिं कर्तुं
नाशक्नुवन्। 11 पश्चात् तै लोभिताः कतिपयजनाः कथामेनाम् अकथयन्,
वयं तस्य भुगतो भूसा एश्वरस्य य निन्दावाक्यम् अश्रौभम्। 12 ते लोकानां
लोकप्राथीनानाम् अध्यापकानाञ्च प्रवृत्तिं जनयित्वा स्तिङ्गानस्य सन्निधिम्
आगत्य तं धृत्वा मडासभामध्यम् आनयन्। 13 तदनन्तरं कतिपयजनेषु
भिष्यासाक्षिषु समानीतेषु तेऽकथयन् अेष जन अेतत्पुण्यस्थानव्यवस्थयो
निन्दातः कदापि न निवर्त्तते। 14 इलतो नासरतीययीशुः स्थानमेतद्
उच्छिन्नं करिष्यति भूसासमर्पितम् अस्माकं व्यवहरणम् अन्यत्रुपं करिष्यति
तस्यैतादृशीं कथां वयम् अशृणुम्। 15 तदा मडासभास्थाः सर्वे तं प्रति
स्थिरां दृष्टिं कृत्वा स्वर्गदूतमुपसदृशं तस्य भुभम् अपश्यन्।

7 ततः परं मडायाजकः पृष्टवान्, ओषा कथां किं सत्या? 2 ततः स प्रत्यवदत्,
हे पितरो हे भ्रातरः सर्वे लाका मनांसि निधद्द्वं। अस्माकं पूर्वंपुरुष
एब्राहीम् डारएनगरे वासकरणात् पूर्वं यदा अराम्-नडरयिमदेशे आसीत्
तदा तेजोमय एश्वरो दर्शनं दत्वा 3 तमवदत् त्वं स्वदेशजातिमित्राणि
परित्यज्य यं देशमहं दर्शयिष्यामि तं देशं प्रज। 4 अतः स कस्दीयदेशं
विहाय डारएनगरे न्यवसत्, तदनन्तरं तस्य पितरि भृते यत्र देशे यूयं
निवसथ स अेनं देशमागच्छत्। 5 किन्तु एश्वरस्तस्मै कमप्यधिकारम्
अर्थाद् अेकपदपरिमितां भूमिमपि नाददात्; तदा तस्य कोपि सन्तानो
नासीत् तथापि सन्तानैः सार्द्धम् अेतस्य देशस्याधिकारी त्वं भविष्यसीति
तम्प्रत्यङ्गीकृतवान्। 6 एश्वर एतथम् अपरमपि कथितवान् तव सन्तानाः

પરદેશે નિવત્સ્યન્તિ તતસ્તદ્દેશીયલોકાશ્રતુઃશતવત્સરાન્ યાવત્ તાન્ દાસત્વે
 સ્થાપયિત્વા તાન્ પ્રતિ કુવ્યવહારં કરિષ્યન્તિ | 7 અપરમ્ ઇશ્વર એનાં
 કથામપિ કથિતવાન્, યે લોકાસ્તાન્ દાસત્વે સ્થાપયિષ્યન્તિ તાલ્લોકાન્ અહં
 દાડયિષ્યામિ, તતઃ પરં તે બહિર્ગતાઃ સન્તો મામ્ અત્ર સ્થાને સેવિષ્યન્તે |
 8 પશ્ચાત્ સ તસ્મૈ ત્વક્ષેદસ્ય નિયમં દત્તવાન્, અત ઇસ્હાકનામ્નિ ઇબ્રાહીમ
 એકપુત્રે જાતે, અષ્ટમદિને તસ્ય ત્વક્ષેદમ્ અકરોત્ | તસ્ય ઇસ્હાકઃ પુત્રો
 યાકૂબ્, તતસ્તસ્ય યાકૂબોડસ્માકં દ્વાદશ પૂર્વપુરુષા અજાયન્ત | 9 તે
 પૂર્વપુરુષા ઈર્ષ્યા પરિપૂર્ણા મિસરદેશં પ્રેષયિતું યૂષકં વ્યકીરણ્ | 10
 કિન્તવીશ્વરસ્તસ્ય સહાયો ભૂત્વા સર્વસ્યા દુર્ગતે રક્ષિત્વા તસ્મૈ બુદ્ધિં દત્વા
 મિસરદેશસ્ય રાજાઃ ફિરૌણઃ પ્રિયપાત્રં કૃતવાન્ તતો રાજા મિસરદેશસ્ય
 સ્વીયસર્વપરિવારસ્ય ચ શાસનપદં તસ્મૈ દત્તવાન્ | 11 તસ્મિન્ સમયે
 મિસર-કિનાનદેશયો દુર્ભિક્ષાહેતોરતિક્લિષ્ટત્વાત્ નઃ પૂર્વપુરુષા ભક્ષ્યદ્રવ્યં
 નાલભન્ત | 12 કિન્તુ મિસરદેશે શસ્યાનિ સન્તિ, યાકૂબ્ ઇમાં વાર્તાં શ્રુત્વા
 પ્રથમમ્ અસ્માકં પૂર્વપુરુષાન્ મિસરં પ્રેષિતવાન્ | 13 તતો દ્વિતીયવારગમને
 યૂષક્ સ્વભ્રાતૃભિઃ પરિચિતોડભવત્; યૂષકો ભ્રાતરઃ ફિરૌણ્ રાજેન પરિચિતા
 અભવન્ | 14 અનન્તરં યૂષક્ ભ્રાતૃગણં પ્રેષ્ય નિજપિતરં યાકૂબં નિજાન્
 પત્રાધિકસપ્તસંખ્યકાન્ જ્ઞાતિજનાંશ્ચ સમાહૂતવાન્ | 15 તસ્માદ્ યાકૂબ્
 મિસરદેશં ગત્વા સ્વયમ્ અસ્માકં પૂર્વપુરુષાશ્ચ તસ્મિન્ સ્થાનેડમિયન્ત |
 16 તતસ્તે શિખિમં નીતા યત્ શ્મશાનમ્ ઇબ્રાહીમ્ મુદ્રાદત્વા શિખિમઃ
 પિતુ હંમોરઃ પુત્રેભ્યઃ કીતવાન્ તત્શ્મશાને સ્થાપયાઞ્ચક્રિરે | 17 તતઃ
 પરમ્ ઇશ્વર ઇબ્રાહીમઃ સન્નિઘૌ શપથં કૃત્વા યાં પ્રતિજ્ઞાં કૃતવાન્ તસ્યાઃ
 પ્રતિજ્ઞાયાઃ ફલનસમયે નિકટે સતિ ઇત્સાયેલ્લોકા સિમરદેશે વર્દ્ધમાના
 બહુસંખ્યા અભવન્ | 18 શેષે યૂષકં યો ન પરિચિનોતિ તાદૃશ એકો
 નરપતિરુપસ્થાય 19 અસ્માકં જ્ઞાતિભિઃ સાદ્ધ્ ધૂર્તતાં વિધાય પૂર્વપુરુષાન્
 પ્રતિ કુવ્યવહરણપૂર્વકં તેષાં વંશનાશનાય તેષાં નવજાતાન્ શિશૂન્ બહિ
 નિરક્ષેપયત્ | 20 એતસ્મિન્ સમયે મૂસા જજ્ઞે, સ તુ પરમસુન્દરોડભવત્ તથા
 પિતૃગૃહે માસત્રયપર્યન્તં પાલિતોડભવત્ | 21 કિન્તુ તસ્મિન્ બહિર્નિક્ષિપ્તે
 સતિ ફિરૌણરાજસ્ય કન્યા તમ્ ઉત્તોલ્ય નીત્વા દત્તકપુત્રં કૃત્વા પાલિતવતી |
 22 તસ્માત્ સ મૂસા મિસરદેશીયાયાઃ સર્વવિધાયાઃ પારદૃષ્ટ્યા સન્ વાક્યે

ક્રિયાયાઞ્ચ શક્તિમાન્ અભવત્ | 23 સ સમ્પૂર્ણયત્વાર્શિશદ્વત્સરવચસ્કો
 ભૂત્વા ઇસ્રાયેલીયવંશનિજબ્રાતૃન્ સાક્ષાત્ કર્તુ મર્તિ ચક્રે | 24 તેષાં જનમેકં
 હિંસિતં દૃષ્ટ્વા તસ્ય સપક્ષઃ સન્ હિંસિતજનમ્ ઉપકૃત્ય મિસરીયજનં
 જઘાન | 25 તસ્ય હસ્તેનેશ્વરસ્તાન્ ઉદ્ધરિષ્યતિ તસ્ય બ્રાતૃગણ ઇતિ
 જ્ઞાસ્યતિ સ ઇત્યનુમાનં ચકાર, કિન્તુ તે ન બુબુધિરે | 26 તત્પરે ડહનિ
 તેષામ્ ઉભયો જનયો વાક્કલહ ઉપસ્થિતે સતિ મૂસાઃ સમીપં ગત્વા તયો
 મૈલનં કર્તુ મર્તિ કૃત્વા કથયામાસ, હે મહાશયૌ યુવાં બ્રાતરૌ પરસ્પરમ્
 અન્યાયં કુતઃ કુરુથઃ? 27 તતઃ સમીપવાસિનં પ્રતિ યો જનોડન્યાયં ચકાર સ
 તં દૂરીકૃત્ય કથયામાસ, અસ્માકમુપરિ શાસ્તૃત્વવિચારયિતૃત્વપદયોઃ કસ્ત્વાં
 નિયુક્તવાન? 28 હ્યો યથા મિસરીયં હતવાન્ તથા કિં મામપિ હનિષ્યસિ?
 29 તદા મૂસા એતાદૃશીં કથાં શ્રુત્વા પલાયનં ચક્રે, તતો મિદિયનદેશં
 ગત્વા પ્રવાસી સન્ તસ્થૌ, તતસ્તત્ર દ્વૌ પુત્રૌ જજ્ઞાતે | 30 અનન્તરં
 યત્વાર્શિશદ્વત્સરેષુ ગતેષુ સીનયપર્વતસ્ય પ્રાન્તરે પ્રજ્વલિતસ્તમ્બસ્ય
 વહ્નિશિખાયાં પરમેશ્વરદૂતસ્તસ્મૈ દર્શનં દદૌ | 31 મૂસાસ્તસ્મિન્ દર્શને
 વિસ્મયં મત્વા વિશેષં જ્ઞાતું નિકટં ગચ્છતિ, 32 એતસ્મિન્ સમયે, અહં તવ
 પૂર્વપુરુષાણામ્ ઇશ્વરોડર્થાદ્ ઇબ્રાહીમ ઇશ્વર ઇસ્હાક ઇશ્વરો યાકૂબ
 ઇશ્વરશ્ચ, મૂસામુદ્દિશ્ય પરમેશ્વરસ્યૈતાદૃશી વિહાયસીયા વાણી બભૂવ,
 તતઃ સ કમ્પાવિતઃ સન્ પુન નિરીક્ષિતું પ્રગલ્ભો ન બભૂવ | 33 પરમેશ્વરસ્તં
 જગાદ, તવ પાદયોઃ પાદુકે મોચય યત્ર તિષ્ઠસિ સા પવિત્રભૂમિઃ | 34 અહં
 મિસરદેશસ્થાનાં નિજલોકાનાં દુર્દશાં નિતાન્તમ્ અપશ્યં, તેષાં કાતર્યોક્તિઞ્ચ
 શ્રુતવાન્ તસ્માત્ તાન્ ઉદ્ધર્તુમ્ અવરુહ્યાગમમ્; ઇદાનીમ્ આગચ્છ મિસરદેશં
 ત્વાં પ્રેષયામિ | 35 કસ્ત્વાં શાસ્તૃત્વવિચારયિતૃત્વપદયો નિયુક્તવાન્,
 ઇતિ વાક્યમુક્ત્વા તૈ યૌ મૂસા અવજ્ઞાતસ્તમેવ ઇશ્વરઃ સ્તમ્બમધ્યે
 દર્શનદાત્રા તેન દૂતેન શાસ્તારં મુક્તિદાતારઞ્ચ કૃત્વા પ્રેષયામાસ | 36
 સ ય મિસરદેશે સૂફનામ્નિ સમુદ્રે ય પશ્ચાત્ યત્વાર્શિશદ્વત્સરાન્ યાવત્
 મહાપ્રાન્તરે નાનાપ્રકારાણ્યદ્ધુતાનિ કર્મ્માણિ લક્ષણાનિ ચ દર્શયિત્વા તાન્
 બહિઃ કૃત્વા સમાનિનાય | 37 પ્રભુઃ પરમેશ્વરો યુષ્માકં બ્રાતૃગણસ્ય
 મધ્યે માદૃશમ્ એકં ભવિષ્યદ્ધક્તારમ્ ઉત્પાદયિષ્યતિ તસ્ય કથાયાં
 યૂયં મનો નિધાસ્યથ, યો જન ઇસ્રાયેલઃ સન્તાનેભ્ય એનાં કથાં

કથયામાસ સ એષ મૂસાઃ | 38 મહાપ્રાન્તરસ્થમાર્ડલીમધ્યેડપિ સ એવ
 સીનયપર્વતોપરિ તેન સાદ્ધં સંલાપિનો દૂતસ્ય ચાસ્મત્પિતૃગણસ્ય મધ્યસ્થઃ
 સન્ અસ્મભ્યં દાતવ્યનિ જીવનદાયકાનિ વાક્યાનિ લેભે | 39 અસ્માકં
 પૂર્વપુરુષાસ્તમ્ અમાન્યં કત્વા સ્વેભ્યો દૂરીકૃત્ય મિસરદેશં પરાવૃત્ય
 ગન્તું મનોભિરભિલષ્ય હારોણં જગદ્ગુઃ, 40 અસ્માકમ્ અગ્રેડગ્રે ગન્તુમ્
 અસ્મદર્થં દેવગણં નિર્માહિં યતો યો મૂસા અસ્માન્ મિસરદેશાદ્ બહિઃ
 કૃત્વાનીતવાન્ તસ્ય કિં જાતં તદસ્માભિર્ન જ્ઞાયતે | 41 તસ્મિન્ સમયે તે
 ગોવત્સાકૃતિં પ્રતિમાં નિર્માય તામુદ્દિશ્ય નૈવેધમુત્મજ્ય સ્વહસ્તકૃતવસ્તુના
 આનન્દિતવન્તઃ | 42 તસ્માદ્ ઈશ્વરસ્તેષાં પ્રતિ વિમુખઃ સન્ આકાશસ્થં
 જ્યોતિર્ગણં પૂજયિતું તેભ્યોડનુમતિં દદૈ, યાદૃશં ભવિષ્યદ્વાદિનાં ગ્રન્થેષુ
 લિખિતમાસ્તે, યથા, ઇસ્રાયેલીયવંશા રે ચત્વારિંશત્સમાન્ પુરા | મહતિ
 પ્રાન્તરે સંસ્થા યૂયન્તુ યાનિ ચ | બલિહોમાદિકર્માણિ કૃતવન્તસ્તુ તાનિ
 કિં | માં સમુદ્દિશ્ય યુષ્માભિઃ પ્રકૃતાનીતિ નૈવ ચ | 43 કિન્તુ વો
 મોલકાખ્યસ્ય દેવસ્ય દૂષ્યમેવ ચ | યુષ્માકં રિમ્હનાખ્યાયા દેવતાયાશ્ચ
 તારકા | એતયોરુભયો મૂર્તી યુષ્માભિઃ પરિપૂજિતે | અતો યુષ્માંસ્તુ બાબેલઃ
 પારં નેષ્યામિ નિશ્ચિતં | 44 અપરઞ્ચ યન્નિદર્શનમ્ અપશ્યસ્તદનુસારેણ
 દૂષ્યં નિર્માહિં યસ્મિન્ ઈશ્વરો મૂસામ્ એતદ્વાક્યં બભાષે તત્ તસ્ય
 નિરૂપિતં સાક્ષ્યસ્વરૂપં દૂષ્યમ્ અસ્માકં પૂર્વપુરુષૈઃ સહ પ્રાન્તરે તસ્થૌ | 45
 પશ્ચાત્ ચિહોશૂયેન સહિતૈસ્તેષાં વંશજાતૈરસ્મત્પૂર્વપુરુષૈઃ સ્વેષાં સમ્મુખાદ્
 ઈશ્વરેણ દૂરીકૃતાનામ્ અન્યદેશીયાનાં દેશાધિકૃતિકાલે સમાનીતં તદ્ દૂષ્યં
 દાયૂદોધિકારં યાવત્ તત્ર સ્થાન આસીત્ | 46 સ દાયૂદ્ પરમેશ્વરસ્યાનુગ્રહં
 પ્રાપ્ય યાકૂબ્ ઈશ્વરાર્થમ્ એકં દૂષ્યં નિર્માતું વવાઞ્છ; 47 કિન્તુ સુલેમાન્
 તદર્થં મન્દિરમ્ એકં નિર્મિતવાન્ | 48 તથાપિ યઃ સર્વોપરિસ્થઃ સ કસ્મિંશ્ચિદ્
 હસ્તકૃતે મન્દિરે નિવસતીતિ નહિ, ભવિષ્યદ્વાદી કથામેતાં કથયતિ, યથા,
 49 પરેશો વદતિ સ્વર્ગો રાજસિંહાસનં મમ | મદીયં પાદપીઠઞ્ચ પૃથિવી
 ભવતિ ધ્રુવં | તર્હિં યૂયં કૃતે મે કિં પ્રનિર્માસ્યથ મન્દિરં | વિશ્રામાય
 મદીયં વા સ્થાનં કિં વિધાતે ત્વિહ | 50 સર્વોણ્યેતાનિ વસ્તૂનિ કિં મે
 હસ્તકૃતાનિ ન | | 51 હે અનાજ્ઞાગ્રાહકા અન્તઃકરણે શ્રવણે યાપવિત્રલોકાઃ
 યૂયમ્ અનવરતં પવિત્રસ્યાત્મનઃ પ્રાતિકૂલ્યમ્ આચરથ, યુષ્માકં પૂર્વપુરુષા

યાદૃશા યૂયમપિ તાદૃશાઃ | 52 યુષ્માકં પૂર્વપુરુષાઃ કં ભવિષ્યદ્વાદિનં
 નાતાડયન્? યે તસ્ય ધાર્મિકસ્ય જનસ્યાગમનકથાં કથિતવન્તસ્તાન્ અઘન્
 યૂયમ્ અધૂના વિશ્વાસઘાતિનો ભૂત્વા તં ધાર્મિકં જનમ્ અહત | 53
 યૂયં સ્વર્ગીયદૂતગણેન વ્યવસ્થાં પ્રાપ્યાપિ તાં નાયરથ | 54 ઇમાં કથાં
 શ્રુત્વા તે મનઃસુ બિદ્ધાઃ સન્તસ્તં પ્રતિ દન્તઘર્ષણમ્ અકુર્વન્ | 55 કિન્તુ
 સ્તિક્ષાનઃ પવિત્રેણાત્મના પૂર્ણો ભૂત્વા ગગણં પ્રતિ સ્થિરદૃષ્ટિં કૃત્વા ઈશ્વરસ્ય
 દક્ષિણે દણ્ડાયમાનં યીશુઞ્ચ વિલોક્ય કથિતવાનઃ | 56 પશ્ય, મેઘદ્વારં
 મુક્તમ્ ઈશ્વરસ્ય દક્ષિણે સ્થિતં માનવસુતઞ્ચ પશ્યામિ | 57 તદા તે
 પ્રોચ્યૈઃ શબ્દં કૃત્વા કર્ણેષ્વજ્જુલી નિધાય એકચિત્તીભૂય તમ્ આક્રમન્ | 58
 પશ્યાત્ તં નગરાદ્ બહિઃ કૃત્વા પ્રસ્તરૈરાઘન્ સાક્ષિણો લાકાઃ શૌલનામ્નો
 યૂનશ્ચરણસન્નિધૌ નિજવસ્ત્રાણિ સ્થાપિતવન્તઃ | 59 અનન્તરં હે પ્રભો
 યીશે મદીયમાત્માનં ગૃહાણ સ્તિક્ષાનસ્યેતિ પ્રાર્થનવાક્યવદનસમયે તે તં
 પ્રસ્તરૈરાઘન્ | 60 તસ્માત્ સ જાનુની પાતયિત્વા પ્રોચ્યૈઃ શબ્દં કૃત્વા, હે
 પ્રભે પાપમેતદ્ એતેષુ મા સ્થાપય, ઇત્યુક્ત્વા મહાનિદ્રાં પ્રાપ્નોત્ |

8 તસ્ય હત્યાકરણં શૌલોપિ સમમન્યત | તસ્મિન્ સમયે ચિરુશાલમ્નગરસ્થાં
 માણ્ડલીં પ્રતિ મહાતાડનાયાં જાતાયાં પ્રેરિતલોકાન્ હિત્વા સર્વેડપરે
 ચિહ્નુદાશોમિરોણદેશયો નાનાસ્થાને વિકીર્ણાઃ સન્તો ગતાઃ | 2 અન્યચ્ય
 ભક્તલોકાસ્તં સ્તિક્ષાનં શ્મશાને સ્થાપયિત્વા બહુ વ્યલપન્ | 3 કિન્તુ
 શૌલો ગૃહે ગૃહે ભ્રમિત્વા સ્ત્રિયઃ પુરુષાંશ્ચ ધૃત્વા કારાયાં બદ્ધ્વા માણ્ડલ્યા
 મહોત્પાતં કૃતવાન્ | 4 અન્યચ્ય યે વિકીર્ણા અભવન્ તે સર્વત્ર ભ્રમિત્વા
 સુસંવાદં પ્રાચારયન્ | 5 તદા ક્ષિલિપઃ શોમિરોણનગરં ગત્વા ખ્રીષ્ટાખ્યાનં
 પ્રાચારયતઃ | 6 તતોડશુચિ-ભૃતગ્રસ્તલોકેભ્યો ભૂતાશ્રીત્કૃત્યાગચ્છન્ તથા
 બહવઃ પક્ષાઘાતિનઃ ખઞ્જા લોકાશ્ચ સ્વસ્થા અભવન્ | 7 તસ્માત્
 લાકા ઈદૃશં તસ્યાશ્ચર્યં કર્મ વિલોક્ય નિશમ્ય ચ સર્વ એકચિત્તીભૂય
 તેનોક્તાખ્યાને મનાંસિ ન્યદધુઃ | 8 તસ્મિન્નગરે મહાનન્દશ્રાભવત્ | 9
 તતઃ પૂર્વં તસ્મિન્નગરે શિમોન્નામા કશ્ચિજ્જનો બહ્વી માર્યાક્રિયાઃ કૃત્વા
 સ્વં કચ્ચન મહાપુરુષં પ્રોચ્ય શોમિરોણીયાનાં મોહં જનયામાસ | 10
 તસ્માત્ સ માનુષ ઈશ્વરસ્ય મહાશક્તિસ્વરૂપ ઇત્યુક્ત્વા બાલવૃદ્ધવનિતાઃ
 સર્વે લાકાસ્તસ્મિન્ મનાંસિ ન્યદધુઃ | 11 સ બહુકાલાન્ માયાવિક્રિયયા

સર્વાન્ અતીવ મોહયાઞ્ચકાર, તસ્માત્ તે તં મેનિરે | 12 કિન્ત્વીશ્વરસ્ય
 રાજ્યસ્ય ચીશુષ્રીષ્ટસ્ય નામ્નશ્ચાખ્યાનપ્રચારિણઃ ક્ષિલિપસ્ય કથાયાં
 વિશ્વસ્ય તેષાં સ્ત્રીપુરુષોભયલોકા મજ્જિજતા અભવન્ | 13 શેષે
 સ શિમોનપિ સ્વયં પ્રત્યૈત્ તતો મજ્જિજતઃ સન્ ક્ષિલિપેન કૃતામ્
 આશ્ચર્યક્રિયાં લક્ષણઞ્ચ વિલોક્યાસમ્ભવં મન્યમાનસ્તેન સહ સ્થિતવાન્ |
 14 ઇત્યં શોમિરોણ્દેશીયલોકા ઇશ્વરસ્ય કથામ્ અગૃહ્ણન્ ઇતિ વાર્તાં
 યિરૂશાલમ્નગરસ્થપ્રેરિતાઃ પ્રાપ્ય પિતરં યોહનઞ્ચ તેષાં નિકટ્ટે પ્રેષિતવન્તઃ |
 15 તતસ્તૌ તત્ સ્થાનમ્ ઉપસ્થાય લોકા યથા પવિત્રમ્ આત્માનં પ્રાપ્નુવન્તિ
 તદર્થં પ્રાર્થયેતાં | 16 યતસ્તે પુરા કેવલપ્રભુચીશો નામ્ના મજ્જિજતમાત્રા
 અભવન્, ન તુ તેષાં મધ્યે કમપિ પ્રતિ પવિત્રસ્યાત્મન આવિર્ભાવો જાતઃ |
 17 કિન્તુ પ્રેરિતાભ્યાં તેષાં ગાત્રેષુ કરેષ્વર્ષિતેષુ સત્સુ તે પવિત્રમ્ આત્માનમ્
 પ્રાપ્નુવન્ | 18 ઇત્યં લોકાનાં ગાત્રેષુ પ્રેરિતયોઃ કરાર્પણેન તાન્ પવિત્રમ્
 આત્માનં પ્રાપ્તાન્ દૃષ્ટ્વા સ શિમોન્ તયોઃ સમીપે મુદ્રા આનીય કથિતવાન્ઃ
 19 અહં યસ્ય ગાત્રે હસ્તમ્ અર્પયિષ્યામિ તસ્યાપિ યથેત્યં પવિત્રાત્મપ્રાપ્તિ
 ભવતિ તાદૃશીં શક્તિં મહાં દત્તં | 20 કિન્તુ પિતરસ્તં પ્રત્યવદત્ તવ
 મુદ્રાસ્ત્વયા વિનશ્યન્તુ યત ઇશ્વરસ્ય દાનં મુદ્રાભિઃ ક્રીયતે ત્વમિત્યં બુદ્ધવાન્ઃ
 21 ઇશ્વરાય તાવન્તઃકરણં સરલં નહિ, તસ્માદ્ અત્ર તવાંશોડધિકારશ્ચ
 કોપિ નાસ્તિ | 22 અત એતત્પાપહેતોઃ ખેદાન્વિતઃ સન્ કેનાપિ પ્રકારેણ તવ
 મનસ એતસ્યાઃ કુકલ્પનાયાઃ ક્ષમા ભવતિ, એતદર્થમ્ ઇશ્વરે પ્રાર્થનાં કુરુઃ
 23 યતસ્ત્વં તિક્તપિત્તે પાપસ્ય બન્ધને ચ યદસિ તન્મયા બુદ્ધમ્ | 24 તદા
 શિમોન્ અકથયત્ તર્હિ યુવાભ્યામુદિતા કથા મયિ યથા ન ફલતિ તદર્થં યુવાં
 મન્નિમિત્તં પ્રભૌ પ્રાર્થનાં કુરુતં | 25 અનેન પ્રકારેણ તૌ સાક્ષ્યં દત્ત્વા પ્રભોઃ
 કથાં પ્રચારયન્તૌ શોમિરોણીયાનામ્ અનેકગ્રામેષુ સુસંવાદઞ્ચ પ્રચારયન્તૌ
 યિરૂશાલમ્નગરં પરાવૃત્ય ગતૌ | 26 તતઃ પરમ્ ઇશ્વરસ્ય દૂતઃ ક્ષિલિપમ્
 ઇત્યાદિશત્, ત્વમુત્થાય દક્ષિણસ્યાં દિશિ યો માર્ગો પ્રાન્તરસ્ય મધ્યેન
 યિરૂશાલમો ડસાનગરં યાતિ તં માર્ગં ગચ્છ | 27 તતઃ સ ઉત્થાય ગતવાન્ઃ તદા
 કન્દાકીનામ્નઃ કૂશલોકાનાં રાજ્યાઃ સર્વસમ્પત્તેરધીશઃ કૂશલેશીય એકઃ ષણ્ડો
 ભજનાર્થ યિરૂશાલમ્નગરમ્ આગત્ય 28 પુનરપિ રથમારુહ્ય યિશયિયનામ્નો
 ભવિષ્યદ્વાદિનો ગ્રન્થં પઠન્ પ્રત્યાગચ્છતિ | 29 એતસ્મિન્ સમયે આત્મા

ફિલિપમ્ અવદત્, ત્વમ્ રથસ્ય સમીપં ગત્વા તેન સાર્દ્ધં મિલ | 30 તસ્માત્
 સ ધાવન્ તસ્ય સન્નિધાવુપસ્થાય તેન પઠયમાનં ચિશયિયથવિષ્યદ્વાદિનો
 વાક્યં શ્રુત્વા પૃષ્ટવાન્ યત્ પઠસિ તત્ કિં બુધ્યસે? 31 તતઃ સ કથિતવાન્
 કેનચિન્ન બોધિતોહં કથં બુધ્યેય? તતઃ સ ફિલિપં રથમારોઢું સ્વેન સાર્દ્ધમ્
 ઉપવેષ્ટુઞ્ચ ન્યવેદયત્ | 32 સ શાસ્ત્રસ્યેતદ્વાક્યં પઠિતવાન્ યથા, સમાનીયત
 ઘાતાય સ યથા મેષશાવકઃ | લોમચ્છેદકસાક્ષાચ્ય મેષશ્ચ નીરવો યથા |
 આબધ્ય વદનં સ્વીયં તથા સ સમતિષ્ઠત | 33 અન્યાયેન વિચારેણ સ
 ઉચ્છિન્નો ડભવત્ તદા | તત્કાલીનમનુષ્યાન્ કો જનો વર્ણયિતું ક્ષમઃ |
 યતો જીવન્નૃણાં દેશાત્ સ ઉચ્છિન્નો ડભવત્ ધ્રુવં | 34 અનન્તરં સ
 ફિલિપમ્ અવદત્ નિવેદયામિ, ભવિષ્યદ્વાદી યામિમાં કથાં કથયામાસ સ કિં
 સ્વસ્મિન્ વા કસ્મિંશ્ચિદ્ અન્યસ્મિન્? 35 તતઃ ફિલિપસ્તત્રકરણમ્ આરભ્ય
 યીશોરુપાખ્યાનં તસ્યાગ્રે પ્રાસ્તૌત્ | 36 ઇત્યં માર્ગેણ ગચ્છન્તૌ જલાશયસ્ય
 સમીપ ઉપસ્થિતૌ; તદા કલીબોડવાદીત્ પશ્યાત્ર સ્થાને જલમાસ્તે મમ
 મજ્જને કા બાધા? 37 તતઃ ફિલિપ ઉત્તરં વ્યાહરત્ સ્વાન્તઃકરણેન સાકં
 યદિ પ્રત્યેષિ તર્હિ બાધા નાસ્તિ | તતઃ સ કથિતવાન્ યીશુપ્રીષ્ટ ઇશ્વરસ્ય
 પુત્ર ઇત્યહં પ્રત્યેમિ | 38 તદા રથં સ્થગિતં કર્તુમ્ આદિષ્ટે ફિલિપકલીબૌ
 દ્વૌ જલમ્ અવારુહતાં; તદા ફિલિપસ્તમ્ મજ્જયામાસ | 39 તત્પશ્ચાત્
 જલમધ્યાદ્ ઉત્થિતયોઃ સતોઃ પરમેશ્વરસ્યાત્મા ફિલિપં હત્વા નીતવાન્,
 તસ્માત્ કલીબઃ પુનસ્તં ન દૃષ્ટવાન્ તથાપિ હૃષ્ટિત્તઃ સન્ સ્વમાર્ગેણ
 ગતવાન્ | 40 ફિલિપશ્ચાસ્દોદ્ગરમ્ ઉપસ્થાય તસ્માત્ કૈસરિયાનગર
 ઉપસ્થિતિકાલપર્યનતં સર્વસ્મિન્નગરે સુસંવાદં પ્રચારયન્ ગતવાન્ |

9 તત્કાલપર્યનતં શૌલઃ પ્રભોઃ શિષ્યાણાં પ્રાતિકૂલ્યેન તાડનાબઘયોઃ કથાં
 નિઃસારયન્ મહાયાજકસ્ય સન્નિધિં ગત્વા 2 સ્ત્રિયં પુરુષઞ્ચ તન્મતગ્રાહિણં
 યં કચ્ચિત્ પશ્યતિ તાન્ ધૃત્વા બદ્ધ્વા ચિરૂશાલમમ્ આનયતીત્યાશયેન
 દમ્ભેષકનગરીયં ધર્મસમાજાન્ પ્રતિ પત્રં યાયિતવાન્ | 3 ગચ્છન્ તુ
 દમ્ભેષકનગરનિકટ ઉપસ્થિતવાન્; તતોડકસ્માદ્ આકાશાત્ તસ્ય ચતુર્દિક્ષુ
 તેજસઃ પ્રકાશનાત્ સ ભૂમાવપતત્ | 4 પશ્ચાત્ હે શૌલ હે શૌલ કુતો માં
 તાડયસિ? સ્વં પ્રતિ પ્રોક્તમ્ એતં શબ્દં શ્રુત્વા 5 સ પૃષ્ટવાન્, હે પ્રભો ભવાન્
 કઃ? તદા પ્રભુરકથયત્ યં યીશું ત્વં તાડયસિ સ એવાહં; કાણ્ટકસ્ય મુખે

પદાઘાતકરણં તવ કષ્ટમ્ | 6 તદા કમ્પમાનો વિસ્મયાપન્નશ્ચ સોવદત્ હે
 પ્રભો મયા કિં કર્તવ્યં? ભવત ઇચ્છા કા? તતઃ પ્રભુરાજ્ઞાપયદ્ ઉત્થાય નગરં
 ગચ્છ તત્ર ત્વયા યત્ કર્તવ્યં તદ્ વદિષ્યતે | 7 તસ્ય સક્તિનો લોકા અપિ તં
 શબ્દં શ્રુતવન્તઃ કિન્તુ કમપિ ન દૃષ્ટ્વા સ્તબ્ધાઃ સન્તઃ સ્થિતવન્તઃ | 8 અનન્તરં
 શૌલો ભૂમિત ઉત્થાય ચક્ષુષી ઉન્મીલ્ય કમપિ ન દૃષ્ટવાન્ | તદા લોકાસ્તસ્ય
 હસ્તૌ ધૃત્વા દમ્ભેષકનગરમ્ આનયન્ | 9 તતઃ સ દિનત્રયં યાવદ્ અન્ધો
 ભૂત્વા ન ભુક્તવાન્ પીતવાંશ્ચ | 10 તદનન્તરં પ્રભુસ્તદ્દમ્ભેષકનગરવાસિન
 એકસ્મૈ શિષ્યાય દર્શનં દત્વા આહૂતવાન્ હે અનનિય | તતઃ સ પ્રત્યવાદીત્
 હે પ્રભો પશ્ય શૃણોમિ | 11 તદા પ્રભુસ્તમાજ્ઞાપયત્ ત્વમુત્થાય સરલનામાનં
 માર્ગં ગત્વા ચિહ્નદાનિવેશને તાર્ષનગરીયં શૌલનામાનં જનં ગવેષયન્ પૃચ્છ;
 12 પશ્ય સ પ્રાર્થયતે, તથા અનનિયનામક એકો જનસ્તસ્ય સમીપમ્ આગત્ય
 તસ્ય ગાત્રે હસ્તાર્પણં કૃત્વા દૃષ્ટિં દદાતીત્યં સ્વપ્ને દૃષ્ટવાન્ | 13 તસ્માદ્
 અનનિયઃ પ્રત્યવદત્ હે પ્રભો ચિરૂશાલમિ પવિત્રલોકાન્ પ્રતિ સોડનેકર્હિસાં
 કૃતવાન્; 14 અત્ર સ્થાને ય યે લોકાસ્તવ નામ્નિ પ્રાર્થયન્તિ તાનપિ
 બદ્ધું સ પ્રધાનયાજકેભ્યઃ શક્તિં પ્રાપ્તવાન્, ઇમાં કથામ્ અહમ્ અનેકેષાં
 મુખેભ્યઃ શ્રુતવાન્ | 15 કિન્તુ પ્રભુરકથયત્, યાહિ ભિન્નદેશીયલોકાનાં
 ભૂપતીનામ્ ઇસ્રાયેલ્લોકાનાઞ્ચ નિકટે મમ નામ પ્રચારયિતું સ જનો મમ
 મનોનીતપાત્રમાસ્તે | 16 મમ નામનિમિત્તઞ્ચ તેન કિયાન્ મહાન્ કલેશો
 ભોક્તવ્ય એતત્ તં દર્શયિષ્યામિ | 17 તતો ડનનિયો ગત્વા ગૃહં પ્રવિશ્ય
 તસ્ય ગાત્રે હસ્તાર્પણં કૃત્વા કથિતવાન્, હે ભ્રાતઃ શૌલ ત્વં યથા દૃષ્ટિં
 પ્રાપ્નોષિ પવિત્રેણાત્મના પરિપૂર્ણો ભવસિ ય, તદર્થં તવાગમનકાલે યઃ
 પ્રભુયીશુસ્તુભ્યં દર્શનમ્ અદદાત્ સ માં પ્રેષિતવાન્ | 18 ઇત્યુક્તમાત્રે તસ્ય
 ચક્ષુર્ભ્યામ્ મીનશલ્કવદ્ વસ્તુનિ નિર્ગતે તત્ક્ષણાત્ સ પ્રસન્નચક્ષુ ભૂત્વા
 પ્રોત્થાય મજ્જિજતોડભવત્ ભુક્ત્વા પીત્વા સબલોભવચ્ચ | 19 તતઃ પરં
 શૌલઃ શિષ્યૈઃ સહ કતિપયદિવસાન્ તસ્મિન્ દમ્ભેષકનગરે સ્થિત્વાડવિલમ્બં
 20 સર્વભજનભવનાનિ ગત્વા યીશુરીશ્વરસ્ય પુત્ર ઇમાં કથાં પ્રચારયત્ |
 21 તસ્માત્ સર્વે શ્રોતારશ્ચમત્કૃત્ય કથિતવન્તો યો ચિરૂશાલમ્નગર
 એતન્નામ્ના પ્રાર્થયિત્લોકાન્ વિનાશિતવાન્ એવમ્ એતાદૃશલોકાન્ બદ્ધ્વા
 પ્રધાનયાજકનિકટં નયતીત્યાશયા એતત્સ્થાનમધ્યાગચ્છત્ સએવ કિમયં ન

ભવતિ? 22 કિન્તુ શૌલઃ ક્રમશઃ ઉત્સાહવાન્ ભૂત્વા યીશુરીશ્વરેણાભિષિક્તો
જન એતસ્મિન્ પ્રમાણં દત્વા દમ્ભેષઙ્-નિવાસિયિહૂદીયલોકાન્ નિરુત્તરાન્
અકરોત્ | 23 ઇત્યં બહુતિથે કાલે ગતે યિહૂદીયલોકાસ્તં હન્તું મન્ત્રયામાસુઃ
24 કિન્તુ શૌલસ્તેષામેતસ્યા મન્ત્રણાયા વાર્તા પ્રાપ્તવાન્ | તે તં હન્તું તુ
દિવાનિશં ગુપ્તાઃ સન્તો નગરસ્ય દ્વારેડતિષ્ઠન્; 25 તસ્માત્ શિષ્યાસ્તં નીત્વા
રાત્રૌ પિટકે નિઘાય પ્રાચીરેણાવારોહયન્ | 26 તતઃ પરં શૌલો યિરૂશાલમં
ગત્વા શિષ્યગણેન સાર્દ્ધં સ્થાતુમ્ ઐહત્, કિન્તુ સર્વ્યે તસ્માદભિભયુઃ
સ શિષ્ય ઇતિ ચ ન પ્રત્યયન્ | 27 એતસ્માદ્ બાર્ણબ્બાસ્તં ગૃહીત્વા
પ્રેરિતાનાં સમીપમાનીય માર્ગમધ્યે પ્રભુઃ કથં તસ્મૈ દર્શનં દત્તવાન્ યાઃ
કથાશ્ચ કથિતવાન્ સ ચ યથાક્ષોભઃ સન્ દમ્ભેષઙ્નગરે યીશો નામિ
પ્રાચારયત્ એતાન્ સર્વ્યવૃત્તાન્તાન્ તાન્ જ્ઞાપિતવાન્ | 28 તતઃ શૌલસ્તૈઃ સહ
યિરૂશાલમિ કાલં યાપયન્ નિર્ભયં પ્રભો ર્ચીશો નામિ પ્રાચારયત્ | 29 તસ્માદ્
અન્યદેશીયલોકૈઃ સાર્દ્ધં વિવાદસ્યોપસ્થિતત્વાત્ તે તં હન્તુમ્ અયેષ્ટન્ | 30
કિન્તુ ભ્રાતૃગણસ્તજ્ઞાત્વા તં કૈસરિયાનગરં નીત્વા તાર્ષનગરં પ્રેષિતવાન્ |
31 ઇત્યં સતિ યિહૂદિયાગાલીલ્શોમિરોણદેશીયાઃ સર્વ્યા માણ્ડલ્યો વિશ્રામં
પ્રાપ્તાસ્તતસ્તાસાં નિષ્ઠાભવત્ પ્રભો ભિયા પવિત્રસ્યાત્મનઃ સાન્ત્વનયા
ચ કાલં ક્ષેપયિત્વા બહુસંખ્યા અભવન્ | 32 તતઃ પરં પિતરઃ સ્થાને
સ્થાને ભ્રમિત્વા શેષે લોદ્રગરનિવાસિપવિત્રલોકાનાં સમીપે સ્થિતવાન્ |
33 તદા તત્ર પક્ષાઘાતવ્યાધિનાષ્ટૌ વત્સરાન્ શય્યાગતમ્ ઐનેયનામાનં
મનુષ્યં સાક્ષત્ પ્રાપ્ય તમવદત્, 34 હે ઐનેય યીશુપ્ત્રીષ્ટસ્ત્વાં સ્વસ્થમ્
અકાર્ષીત્, ત્વમુત્થાય સ્વશય્યાં નિક્ષિપ, ઇત્યુક્તમાત્રે સ ઉદતિષ્ઠત્ | 35
એતાદૃશં દૃષ્ટ્વા લોદ્શારોણનિવાસિનો લોકાઃ પ્રભું પ્રતિ પરાવર્તન્ત | 36
અપરઞ્ચ ભિક્ષાદાનાદિષુ નાનક્રિયાસુ નિત્યં પ્રવૃત્તા યા યાફોનગરનિવાસિની
ટાભિથાનામા શિષ્યા યાં દક્કા અર્થાદ્ હરિણીમયુક્ત્વા આહ્વયન્ સા
નારી 37 તસ્મિન્ સમયે રુગ્ના સતી પ્રાણાન્ અત્યજત્, તતો લોકાસ્તાં
પ્રક્ષાલ્યોપરિસ્થપ્રકોષ્ઠે શાયયિત્વાસ્થાપયન્ | 38 લોદ્રગરં યાફોનગરસ્ય
સમીપસ્થં તસ્માત્તત્ર પિતર આસ્તે, ઇતિ વાર્તા શ્રુત્વા તૂર્ણા તસ્યાગમનાર્થં
તસ્મિન્ વિનયમુક્ત્વા શિષ્યગણો દ્વૌ મનુજૌ પ્રેષિતવાન્ | 39 તસ્માત્ પિતર
ઉત્થાય તાભ્યાં સાર્દ્ધમ્ આગચ્છત્, તત્ર તસ્મિન્ ઉપસ્થિત ઉપરિસ્થપ્રકોષ્ઠે

समानीते य विधवाः स्वाभिः सः स्थितिकाले दर्क्या कृतानि यान्युत्तरीयाणि
परिधेयानि य तानि सर्वाणि तं दर्शयित्वा रुदत्यश्रुतसृषु दिक्ष्वतिष्ठन् | 40
किन्तु पितरस्ताः सर्वा बहिः कृत्वा जनुनी पातयित्वा प्रार्थितवान्; पश्चात्
शवं प्रति दृष्टिं कृत्वा कथितवान्, हे टाबीथे त्वमुत्तिष्ठ, एति वाक्य उक्ते
सा स्त्री यक्षुषी प्रोन्मील्य पितरम् अवलोक्योत्थायोपाविशत् | 41 ततः
पितरस्तस्याः करौ धृत्वा उत्तोल्य पवित्रलोकान् विधवाश्चाडूय तेषां निकटे
सञ्जवां तां समार्पयत् | 42 अेषा कथा समस्तयाज्ञानगरं व्याप्ता तस्माद्
अनेके लोकाः प्रभौ व्यश्वसन् | 43 अपरञ्च पितरस्तथाज्ञानगरीयस्य
कस्यचित् शिमोन्नाभश्चर्मकारस्य गृहे बडुटिनानि न्यवसत् |

10 कैसरियानगर एतालियाप्यसैन्यान्तर्गतः कर्णिलियनामा
सेनापतिरासीत् 2 स सपरिवारो भक्त ईश्वरपरायणश्चासीत्; लोकेभ्यो
बडूनि दानादीनि दत्त्वा निरन्तरम् ईश्वरे प्रार्थयाञ्चके | 3 अकदा
तृतीयप्रहरवेलायां स दृष्टवान् ईश्वरस्यैको दूतः सप्रकाशं तत्समीपम्
आगत्य कथितवान्, हे कर्णिलिय | 4 किन्तु स तं दृष्ट्वा भीतोऽकथयत्, हे
प्रभो किं? तदा तमवदत् तव प्रार्थना दानादि य साक्षिस्वर्णं भूत्वेश्वरस्य
गोचरमभवत् | 5 एदानीं याज्ञानगरं प्रति लोकान् प्रेष्य समुद्रतीरे
शिमोन्नाभश्चर्मकारस्य गृहे प्रवासकारी पितरनाम्ना विख्यातो यः शिमोन्
तम् आह्वयय; 6 तस्मात् त्वया यधत् कर्तव्यं तत्तत् स वदिष्यति | 7
एत्युपदिश्य दूते प्रस्थिते सति कर्णिलियः स्वगृहस्थानां दासानां द्वौ जनौ
नित्यं स्वसङ्गिनां सैन्यानाम् अेकां भक्तसेनाञ्चाडूय 8 सकलमेतं वृत्तान्तं
विज्ञाप्य याज्ञानगरं तान् प्राडिणोत् | 9 परस्मिन् दिने ते यात्रां कृत्वा यदा
नगरस्य समीप उपातिष्ठन्, तदा पितरो द्वितीयप्रहरवेलायां प्रार्थयितुं
गृहपृष्ठम् आरोहत् | 10 अतस्मिन् समये क्षुधार्तः सन् किञ्चिद् भोक्तुम्
अैच्छत् किन्तु तेषाम् अन्नासादनसमये स मूर्च्छितः सन्नपतत् | 11 ततो
मेघद्वारं मुक्तं यतुर्भिः कोणैर् लम्बितं बृहद्वस्त्रमिव किञ्चन भाजनम्
आकाशात् पृथिवीम् अवारोहतीति दृष्टवान् | 12 तन्मध्ये नानप्रकारा
ग्राभ्यवन्धपशवः भेयरोरोगाभिप्रभृतयो जन्तवश्चासन् | 13 अनन्तरं हे
पितर उत्याय इत्वा भुंक्ष्व तम्प्रतीयं गगणीया वाणी जता | 14 तदा
पितरः प्रत्यवदत्, हे प्रभो एदृशं मा भवतु, अहम् अेतत् कालं यावत्

નિષિદ્ધમ્ અશુચિ વા દ્રવ્યં કિઞ્ચિદપિ ન ભુક્તવાન્ | 15 તતઃ પુનરપિ
 તાદૃશી વિહયસીયા વાણી જાતા યદ્ ઇશ્વરઃ શુચિ કૃતવાન્ તત્ ત્વં નિષિદ્ધં
 ન જાનીહિ | 16 ઇત્યં ત્રિઃ સતિ તત્ પાત્રં પુનરાકૃષ્ટં આકાશમ્ અગચ્છત્ |
 17 તતઃ પરં યદ્ દર્શનં પ્રાપ્તવાન્ તસ્ય કો ભાવ ઇત્યત્ર પિતરો મનસા
 સન્દેગ્ધિ, એતસ્મિન્ સમયે કર્ણીલિયસ્ય તે પ્રેષિતા મનુષ્યા દ્વારસ્ય
 સન્નિધાવુપસ્થાય, 18 શિમોનો ગૃહમન્વિચ્છન્તઃ સમ્પૃષ્ટ્યાહૂય કથિતવન્તઃ
 પિતરનામ્ના વિખ્યાતો યઃ શિમોન્ સ કિમત્ર પ્રવસતિ? 19 યદા
 પિતરસ્તદ્દર્શનસ્ય ભાવં મનસાન્દોલયતિ તદાત્મા તમવદત્, પશ્ય ત્રયો
 જનાસ્ત્વાં મૃગયન્તે | 20 ત્વમ્ ઉત્થાયાવરુહ્ય નિઃસન્દેહં તૈઃ સહ ગચ્છ મથૈવ
 તે પ્રેષિતાઃ | 21 તસ્માત્ પિતરોડવરુહ્ય કર્ણીલિયપ્રેરિતલોકાનાં
 નિકટમાગત્ય કથિતવાન્ પશ્યત યૂયં યં મૃગયધ્વે સ જનોહં, યૂયં
 કિન્નિમિત્તમ્ આગતાઃ? 22 તતસ્તે પ્રત્યવદન્ કર્ણીલિયનામા શુદ્ધસત્વ
 ઇશ્વરપરાયણો ચિહ્નૂદીયદેશસ્થાનાં સર્વેષાં સન્નિધૌ સુખ્યાત્યાપન્ન એકઃ
 સેનાપતિ નિજગૃહં ત્વામાહૂય નેતું ત્વત્તઃ કથા શ્રોતુઞ્ચ પવિત્રદૂતેન
 સમાદિષ્ટઃ | 23 તદા પિતરસ્તાનભ્યન્તરં નીત્વા તેષામાતિથ્યં કૃતવાન્,
 પરેડહનિ તૈઃ સાર્દ્ધં યાત્રામકરોત્, યાકોનિવાસિનાં ભ્રાતૃણાં કિયન્તો જનાશ્ચ
 તેન સહ ગતાઃ | 24 પરસ્મિન્ દિવસે કૈસરિયાનગરમધ્યપ્રવેશસમયે
 કર્ણીલિયો જ્ઞાતિબન્ધૂન્ આહૂયાનીય તાન્ અપેક્ષ્ય સ્થિતઃ | 25 પિતરે ગૃહ
 ઉપસ્થિતે કર્ણીલિયસ્તં સાક્ષાત્કૃત્ય ચરણયોઃ પતિત્વા પ્રાણમત્ | 26
 પિતરસ્તમુત્થાપ્ય કથિતવાન્, ઉત્તિષ્ઠાહમપિ માનુષઃ | 27 તદા કર્ણીલિયેન
 સાકમ્ આલપન્ ગૃહં પ્રાવિશત્ તન્મધ્યે ચ બહુલોકાનાં સમાગમં દૃષ્ટ્વા તાન્
 અવદત્, 28 અન્યજાતીયલોકૈઃ મહાલપનં વા તેષાં ગૃહમધ્યે પ્રવેશનં
 ચિહ્નૂદીયાનાં નિષિદ્ધમ્ અસ્તીતિ યૂયમ્ અવગચ્છથ; કિન્તુ કમપિ માનુષમ્
 અવ્યવહાર્યમ્ અશુચિં વા જ્ઞાતું મમ નોચિતમ્ ઇતિ પરમેશ્વરો માં
 જ્ઞાપિતવાન્ | 29 ઇતિ હેતોરાહ્યાનશ્રવણમાત્રાત્ કાઞ્ચનાપત્તિમ્ અકૃત્વા
 યુષ્માકં સમીપમ્ આગતોસ્મિ; પૃષ્ઠામિ યૂયં કિન્નિમિત્તં મામ્ આહૂયત? 30
 તદા કર્ણીલિયઃ કથિતવાન્, અથ યત્વારિ દિનાનિ જાતાનિ એતાવદ્દેલાં
 યાવદ્ અહમ્ અનાહાર આસન્ તતસ્તૃતીયપ્રહરે સતિ ગૃહે પ્રાર્થનસમયે
 તેજોમયવસ્ત્રભૃદ્ એકો જનો મમ સમક્ષં તિષ્ઠન્ એતાં કથામ્ અકથયત્, 31

હે કર્ણાલિય ત્વદીયા પ્રાર્થના ઈશ્વરસ્ય કર્ણગોચરીભૂતા તવ દાનાદિ ચ
 સાક્ષિસ્વરૂપં ભૂત્વા તસ્ય દૃષ્ટિગોચરમભવત્ | 32 અતો યાદ્ગોનગરં પ્રતિ
 લોકાન્ પ્રહિત્ય તત્ર સમુદ્રતીરે શિમોન્નામ્નઃ કસ્યચિચ્યર્મ્મકારસ્ય ગૃહે
 પ્રવાસકારી પિતરનામ્ના વિખ્યાતો યઃ શિમોન્ તમાહૂચયઃ; તતઃ સ આગત્ય
 ત્વામ્ ઉપદેક્ષ્યતિ | 33 ઇતિ કારણાત્ તત્ક્ષણાત્ તવ નિકટે લોકાન્
 પ્રેષિતવાન્, ત્વમાગતવાન્ ઇતિ ભદ્રં કૃતવાન્ | ઈશ્વરો યાન્યાખ્યાનાનિ
 કથયિતુમ્ આદિશત્ તાનિ શ્રોતું વયં સર્વે સામ્પ્રતમ્ ઈશ્વરસ્ય સાક્ષાદ્
 ઉપસ્થિતાઃ સ્મઃ | 34 તદા પિતર ઇમાં કથાં કથયિતુમ્ આરબ્ધવાન્, ઈશ્વરો
 મનુષ્યાણામ્ અપક્ષપાતી સન્ 35 યસ્ય કસ્યચિદ્ દેશસ્ય યો
 લોકાસ્તસ્માદ્ભીત્વા સત્કર્મ્મ કરોતિ સ તસ્ય ગ્રાહ્યો ભવતિ, એતસ્ય
 નિશ્રયમ્ ઉપલબ્ધવાનહમ્ | 36 સર્વેષાં પ્રભુ યો યીશુપ્રીષ્ટસ્તેન ઈશ્વર
 ઇસ્રાયેલ્વંશાનાં નિકટે સુસંવાદં પ્રેષ્ય સમ્મેલનસ્ય યં સંવાદં પ્રાચારયત્ તં
 સંવાદં યૂયં શ્રુતવન્તઃ | 37 યતો યોહના મજ્જને પ્રચારિતે સતિ સ
 ગાલીલદેશમારભ્ય સમસ્તચિહ્નદીયદેશં વ્યાખ્નોત્; 38 ફલત ઈશ્વરેણ
 પવિત્રેણાત્મના શક્ત્યા યાભિષિક્તો નાસરતીયયીશુઃ સ્થાને સ્થાને ભ્રમન્
 સુક્રિયાં કુર્વન્ શૈતાના ક્લિષ્ટાન્ સર્વલોકાન્ સ્વસ્થાન્ અકરોત્, યત
 ઈશ્વરસ્તસ્ય સહાય આસીત્; 39 વયઞ્ચ ચિહ્નદીયદેશે ચિહ્નશાલમ્નગરે ય
 તેન કૃતાનાં સર્વેષાં કર્મ્મણાં સાક્ષિણો ભવામઃ | લોકાસ્તં કુશે વિદ્ધ્વા
 હતવન્તઃ, 40 કિન્તુ તૃતીયદિવસે ઈશ્વરસ્તમુત્થાપ્ય સપ્રકાશમ્ અદર્શયત્ |
 41 સર્વલોકાનાં નિકટ ઇતિ ન હિ, કિન્તુ તસ્મિન્ શ્મશાનાદુત્થિતે સતિ તેન
 સાર્દ્ધ્ ભોજનં પાનઞ્ચ કૃતવન્ત એતાદૃશા ઈશ્વરસ્ય મનોનીતાઃ સાક્ષિણો યે
 વયમ્ અસ્માકં નિકટે તમદર્શયત્ | 42 જીવિતમૃતોભયલોકાનાં વિચારં
 કર્તુમ્ ઈશ્વરો યં નિયુક્તવાન્ સ એવ સ જનઃ, ઇમાં કથાં પ્રચારયિતું તસ્મિન્
 પ્રમાણં દાતુઞ્ચ સોઽસ્માન્ આજ્ઞાપયત્ | 43 યસ્તસ્મિન્ વિશ્વસિતિ સ તસ્ય
 નામ્ના પાપાન્મુક્તો ભવિષ્યતિ તસ્મિન્ સર્વે ભવિષ્યદ્વાદિનોપિ એતાદૃશં
 સાક્ષ્યં દદતિ | 44 પિતરસ્યૈતત્કથાકથનકાલે સર્વેષાં શ્રોતૃણામુપરિ પવિત્ર
 આત્માવારોહત્ | 45 તતઃ પિતરેણ સાર્દ્ધ્મ્ આગતાસ્ત્વક્ષેદિનો
 વિશ્વાસિનો લોકા અન્યદેશીયેભ્યઃ પવિત્ર આત્માનિ દત્તે સતિ 46 તે
 નાનાજાતીયભાષાભિઃ કથાં કથયન્ત ઈશ્વરં પ્રશંસન્તિ, ઇતિ દૃષ્ટ્વા શ્રુત્વા ય

વિસ્મયમ્ આપદન્ત | 47 તદા પિતરઃ કથિતવાન્ વયમિવ યે પવિત્રમ્
આત્માનં પ્રાપ્તાસ્તેષાં જલમજ્જનં કિં કોપિ નિષેદ્ધં શક્નોતિ? 48 તતઃ
પ્રભો નામ્ના મજ્જિજતા ભવતેતિ તાનાજ્ઞાપયત્ | અનન્તરં તે સ્વૈઃ સાર્દ્ધં
કતિપયદિનાનિ સ્થાતું પ્રાર્થયન્ત |

11 ઇત્યં ભિન્નદેશીયલોકા અપીશ્વરસ્ય વાક્યમ્ અગૃહ્ણન્ ઇમાં વાર્તાં
થિહૂદીયદેશસ્થપ્રેરિતા બ્રાતૃગણશ્ચ શ્રુતવન્તઃ | 2 તતઃ પિતરે ચિરૂશાલમ્ગરં
ગતવતિ ત્વક્ષેદિનો લોકાસ્તેન સહ વિવદમાના અવદન્ 3 ત્વમ્
અત્વક્ષેદિલોકાનાં ગૃહં ગત્વા તૈઃ સાર્દ્ધં ભુક્તવાન્ | 4 તતઃ પિતર આદિતઃ
ક્રમશસ્તત્કાર્યસ્ય સર્વવૃતાન્તમાખ્યાતુમ્ આરબ્ધવાન્ | 5 યાફ્નોનગર
એકદાહં પ્રાર્થયમાનો મૂર્ચ્છિતઃ સન્ દર્શનેન ચતુર્ષુ કોણેષુ લમ્બનમાનં
વૃહદ્વસ્ત્રમિવ પાત્રમેકમ્ આકાશદવરુદ્ધ મન્નિકટમ્ આગચ્છદ્ અપશ્યમ્ |
6 પશ્ચાત્ તદ્ અનન્યદૃષ્ટ્યા દૃષ્ટ્વા વિવિચ્ય તસ્ય મધ્યે નાનાપ્રકારાન્
ગ્રામ્યવન્યપશૂન્ ઉરોગામિખેયરાંશ્ચ દૃષ્ટવાન્; 7 હે પિતર ત્વમુત્થાય ગત્વા
ભુંક્ષ્વ માં સમ્બોધ્ય કથયન્તં શબ્દમેકં શ્રુતવાંશ્ચ | 8 તતોહં પ્રત્યવદં, હે
પ્રભો નેત્યં ભવતુ, યતઃ કિઞ્ચન નિષિદ્ધમ્ અશુચિ દ્રવ્યં વા મમ મુખમધ્યં
કદાપિ ન પ્રાવિશત્ | 9 અપરમ્ ઇશ્વરો યત્ શુચિ કૃતવાન્ તન્નિષિદ્ધં ન
જાનીહિ દ્વિ મામ્પ્રતીદૃશી વિહાયસીયા વાણી જાતા | 10 ત્રિરિત્યં સતિ
તત્ સર્વ્યં પુનરાકાશમ્ આકૃષ્ટં | 11 પશ્ચાત્ કૈસરિયાનગરાત્ ત્રયો જના
મન્નિકટં પ્રેષિતા યત્ર નિવેશને સ્થિતોહં તસ્મિન્ સમયે તત્રોપાતિષ્ઠન્ | 12
તદા નિઃસન્દેહં તૈઃ સાર્દ્ધં યાતુમ્ આત્મા મામાદિષ્ટવાન્; તતઃ પરં મયા સહૈતેષુ
ષડ્બ્રાતૃષુ ગતેષુ વયં તસ્ય મનુજસ્ય ગૃહં પ્રાવિશામ | 13 સોસ્માકં નિકટે
કથામેતામ્ અકથયત્ એકદા દૂત એકઃ પ્રત્યક્ષીભૂય મમ ગૃહમધ્યે તિષ્ઠન્
મામિત્યાજ્ઞાપિતવાન્ યાફ્નોનગરં પ્રતિ લોકાન્ પ્રહિત્ય પિતરનામ્ના વિખ્યાતં
શિમોનમ્ આહૂયય; 14 તતસ્તવ ત્વદીયપરિવારાણાઞ્ચ યેન પરિત્રાણં
ભવિષ્યતિ તત્ સ ઉપદેક્ષ્યતિ | 15 અહં તાં કથામુત્થાપ્ય કથિતવાન્ તેન
પ્રથમમ્ અસ્માકમ્ ઉપરિ યથા પવિત્ર આત્માવરૂઢવાન્ તથા તેષામધ્યુપરિ
સમવરૂઢવાન્ | 16 તેન યોહન્ જલે મજ્જિજતવાન્ ઇતિ સત્યં કિન્તુ યૂયં
પવિત્ર આત્મનિ મજ્જિજતા ભવિષ્યથ, ઇતિ ચદ્વાક્યં પ્રભુરુદિતવાન્ તત્
તદા મયા સ્મૃતમ્ | 17 અતઃ પ્રભા યીશુપ્ત્રીષ્ટે પ્રત્યયકારિણો યે વયમ્

અસ્મભ્યમ્ ઈશ્વરો યદ્ દત્તવાન્ તત્ તેભ્યો લોકેભ્યોપિ દત્તવાન્ તતઃ
કોહં? કિમહમ્ ઈશ્વરં વારયિતું શકનોમિ? 18 કથામેતાં શ્રુવા તે ક્ષાન્તા
ઈશ્વરસ્ય ગુણાન્ અનુકીર્ત્ય કથિતવન્તઃ, તર્હિ પરમાયુઃપ્રાપ્તિનિમિત્તમ્
ઈશ્વરોન્યદેશીયલોકેભ્યોપિ મનઃપરિવર્તનરૂપં દાનમ્ અદાત્ | 19 સ્તિક્કાનં
પ્રતિ ઉપદ્રવે ઘટિતે યે વિકીર્ણા અભવન્ તૈ કૈનીકીકુપ્રાન્તિયખિયાસુ
ભ્રમિત્વા કેવલચિહ્નૈયલોકાન્ વિના કસ્યાપ્યન્યસ્ય સમીપ ઈશ્વરસ્ય
કથાં ન પ્રાચારયન્ | 20 અપરં તેષાં કુપ્રીયાઃ કુરીનીયાશ્ચ કિયન્તો જના
આન્તિયખિયાનગરં ગત્વા યૂનાનીયલોકાનાં સમીપેપિ પ્રભોર્યોશોઃ કથાં
પ્રાચારયન્ | 21 પ્રભોઃ કરસ્તેષાં સહાય આસીત્ તસ્માદ્ અનેકે લોકા વિશ્વસ્ય
પ્રભું પ્રતિ પરાવર્તન્ત | 22 ઇતિ વાર્તાયાં ચિરૂશાલમસ્થમણ્ડલીયલોકાનાં
કર્ણગોચરીભૂતાયામ્ આન્તિયખિયાનગરં ગન્તુ તે બાર્ણબ્બાં પ્રૈરયન્ | 23
તતો બાર્ણબ્બાસ્તત્ર ઉપસ્થિતઃ સન્ ઈશ્વરસ્યાનુગ્રહસ્ય ફલં દૃષ્ટ્વા સાનન્દો
જાતઃ, 24 સ સ્વયં સાધુ વિશ્વાસેન પવિત્રેણાત્મના ય પરિપૂર્ણઃ સન્
ગનોનિષ્ઠયા પ્રભાવાસ્થાં કર્તુ સર્વાન્ ઉપદિષ્ટવાન્ તેન પ્રભોઃ શિષ્યા અનેકે
બભૂવુઃ | 25 શેષે શૌલં મૃગયિતું બાર્ણબ્બાસ્તાર્ષનગરં પ્રસ્થિતવાન્ |
તત્ર તસ્યોદ્દેશં પ્રાપ્ય તમ્ આન્તિયખિયાનગરમ્ આનયત્; 26 તતસ્તૌ
મણ્ડલીસ્થલોકૈઃ સભાં કૃત્વા સંવત્સરમેકં યાવદ્ બહુલોકાન્ ઉપાદિશતાં;
તસ્મિન્ આન્તિયખિયાનગરે શિષ્યાઃ પ્રથમં ખ્રીષ્ટીયનામ્ના વિખ્યાતા
અભવન્ | 27 તતઃ પરં ભવિષ્યદ્વાદિગણે ચિરૂશાલમ આન્તિયખિયાનગરમ્
આગતે સતિ 28 આગાબનામા તેષામેક ઉત્થાય આત્મનઃ શિક્ષયા સર્વદેશે
દુર્ભિક્ષં ભવિષ્યતીતિ જ્ઞાપિતવાન્; તતઃ કલૌદિયકૈસરસ્યાધિકારે સતિ તત્
પ્રત્યક્ષમ્ અભવત્ | 29 તસ્માત્ શિષ્યા એકૈકશઃ સ્વસ્વશક્ત્યનુસારતો
ચિહ્નૈયદેશનિવાસિનાં ભ્રતૃણાં દિનયાપનાર્થ ધનં પ્રેષયિતું નિશ્ચિત્ય 30
બાર્ણબ્બાશૌલયો દ્વારા પ્રાચીનલોકાનાં સમીપં તત્ પ્રેષિતવન્તઃ |

12 તસ્મિન્ સમયે હેરોદ્દરાજો મણ્ડલ્યાઃ કિયજ્જનેભ્યો દુઃખં દાતું
પ્રારભત્ | 2 વિશેષતો યોહનઃ સોદરં યાકૂબં કરવાલાઘાતેન્ હતવાન્ |
3 તસ્માદ્ ચિહ્નૈયાઃ સન્તુષ્ટા અભવન્ ઇતિ વિજ્ઞાય સ પિતરમપિ ધર્તુ
ગતવાન્ | 4 તદા કિણ્વશૂન્યપૂષ્પોત્સવસમય ઉપાતિષ્ટત્; અત ઉત્સવે
ગતે સતિ લોકાનાં સમક્ષં તં બહિરાનેય્યામીતિ મનસિ સ્થિરીકૃત્ય સ

તં ધારયિત્વા રક્ષણાર્થમ્ યેષામ્ એકૈકસંઘે ચત્વારો જનાઃ સન્તિ તેષાં
 ચતુર્ણાં રક્ષકસંઘાનાં સમીપે તં સમર્થ્ય કારાયાં સ્થાપિતવાન્ | 5 કિન્તુ
 પિતરસ્ય કારાસ્થિતિકારણાત્ માર્ડલ્યા લોકા અવિશ્રામમ્ ઈશ્વરસ્ય સમીપે
 પ્રાર્થયન્ત | 6 અનન્તરં હેરોદિ તં બહિરાનાયિતું ઉઘતે સતિ તસ્યાં રાત્રૌ
 પિતરો રક્ષકદ્વયમધ્યસ્થાને શૃંગ્ખલદ્વયેન બદ્ધ્વઃ સન્ નિદ્રિત આસીત્
 દૌવારિકાશ્ચ કારાયાઃ સમ્મુખે તિષ્ઠનતો દ્વારમ્ અરક્ષિષુઃ | 7 એતસ્મિન્ સમયે
 પરમેશ્વરસ્ય દૂતે સમુપસ્થિતે કારા દીપ્તિમતી જાતા; તતઃ સ દૂતઃ પિતરસ્ય
 કુક્ષાવાવાતં કૃત્વા તં જાગરયિત્વા ભાષિતવાન્ તૂર્ણમુત્તિષ્ઠ; તતસ્તસ્ય
 હસ્તસ્થશૃંગ્ખલદ્વયં ગલત્ પતિતં | 8 સ દૂતસ્તમવદત્ બદ્ધકટિઃ સન્ પાદયોઃ
 પાદુકે અર્પયઃ; તેન તથા કૃતે સતિ દૂતસ્તમ્ ઉક્તવાન્ ગાત્રીયવસ્ત્રં ગાત્રે
 નિધાય મમ પશ્ચાદ્ એહિ | 9 તતઃ પિતરસ્તસ્ય પશ્ચાદ્ વ્રજન બહિરગચ્છત્
 કિન્તુ દૂતેન કર્મૈતત્ કૃતમિતિ સત્યમજ્ઞાત્વા સ્વપ્નદર્શનં જ્ઞાતવાન્ | 10
 ઇત્યં તૌ પ્રથમાં દ્વિતીયાઞ્ચ કારાં લક્ષિત્વા યેન લૌહનિર્મિતદ્વારેણ નગરં
 ગમ્યતે તત્સમીપં પ્રાપ્નુતાં; તતસ્તસ્ય કવાટં સ્વયં મુક્તમભવત્ તતસ્તૌ
 તત્સ્થાનાદ્ બહિ ભૂત્વા માર્ગેકસ્ય સીમાં યાવદ્ ગતૌ; તતોડકસ્માત્ સ દૂતઃ
 પિતરં ત્યક્તવાન્ | 11 તદા સ ચેતનાં પ્રાપ્ય કથિતવાન્ નિજદૂતં પ્રહિત્ય
 પરમેશ્વરો હેરોદો હસ્તાદ્ યિહૂદીયલોકાનાં સર્વાશાયાશ્ચ માં સમુદ્ધૃતવાન્
 ઇત્યહં નિશ્ચયં જ્ઞાતવાન્ | 12 સ વિવિચ્ય માર્કનામ્ના વિખ્યાતસ્ય ચોહનો
 માતુ મરિચમો યસ્મિન્ ગૃહે બહવઃ સમ્ભૂય પ્રાર્થયન્ત તન્નિવેશનં ગતઃ | 13
 પિતરેણ બહિર્દ્વાર આહતે સતિ રોદાનામા બાલિકા દ્રષ્ટું ગતા | 14 તતઃ
 પિતરસ્ય સ્વરં શ્રુવા સા હર્ષયુક્તા સતી દ્વારં ન મોચયિત્વા પિતરો દ્વારે
 તિષ્ઠતીતિ વાર્તાં વક્તુમ્ અભ્યન્તરં ધાવિત્વા ગતવતી | 15 તે પ્રાવોચન્
 ત્યમુન્મત્તા જાતાસિ કિન્તુ સા મુહુર્મુહુરુક્તવતી સત્યમેવૈતત્ | 16 તદા તે
 કથિતવન્તસ્તર્હિ તસ્ય દૂતો ભવેત્ | 17 પિતરો દ્વારમાહતવાન્ એતસ્મિન્નન્તરે
 દ્વારં મોચયિત્વા પિતરં દૃષ્ટ્વા વિસ્મયં પ્રાપ્તાઃ | 18 તતઃ પિતરો નિઃશબ્દં
 સ્થાતું તાન્ પ્રતિ હસ્તેન સજ્ઞેતં કૃત્વા પરમેશ્વરો યેન પ્રકારેણ તં કારાયા
 ઉદ્ધૃત્યાનીતવાન્ તસ્ય વૃત્તાન્તં તાનજ્ઞાપયત્, યૂયં ગત્વા યાકુબં બ્રાતૃગણઞ્ચ
 વાર્તામેતાં વદતેત્યુક્તા સ્થાનાન્તરં પ્રસ્થિતવાન્ | 19 પ્રભાતે સતિ પિતરઃ ક્વ
 ગત ઇત્યત્ર રક્ષકાણાં મધ્યે મહાન્ કલહો જાતઃ | 20 હેરોદ્ બહુ મૃગયિત્વા

तस्योद्देशे न प्राप्ते सति रक्षकान् संपृच्छ्य तेषां प्राणान् हन्तुम् आदिष्टवान्।
 21 पश्चात् स यिद्धूदीयप्रदेशात् कैसरियानगरं गत्वा तत्रावातिष्ठत्। 22
 सोरसीदोनदेशयोर् लोकेभ्यो हरोदि युयुत्सौ सति ते सर्व्व अक्रमन्त्राणाः
 सन्तस्तस्य समीपे उपस्थाय त्वास्तनामानं तस्य वस्त्रगृहाधीशं सहायं
 कृत्वा हरोदा साद्धं सन्धिं प्रार्थयन्त यतस्तस्य राज्ञो देशेन तेषां देशीयानां
 भरणम् अभवत् 23 अतः कुत्रयिन् निरुपितदिने हरोद् राजकीयं परिच्छदं
 परिधाय सिंहासने समुपविश्य तान् प्रति कथाम् उक्तवान्। 24 ततो लोका
 उच्यैः कारं प्रत्यवदन्, अेष मनुजरो न हि, एश्वरीयरवः। 25 तदा हरोद्
 एश्वरस्य सम्मानं नाकरोत्; तस्माद्धेतोः परमेश्वरस्य दूतो ढडात् तं प्राडरत्
 तेनैव स कीटैः क्षीणः सन् प्राणान् अजडात्। किन्त्वीश्वरस्य कथा देशं
 व्याप्य प्रबलाभवत्। ततः परं बार्णव्वाशौलौ यस्य कर्म्मणो भारं प्राप्नुतां
 ताभ्यां तस्मिन् सम्पादिते सति मार्कनाम्ना विख्यातो यो योडन् तं सङ्गिनं
 कृत्वा यिडुशालभनगरात् प्रत्यागतौ।

13 अपरञ्च बार्णव्वाः, शिमोन् यं निग्रं वदन्ति, कुरीनीयलूकियो
 हरोदा राज्ञा सह कृतविधाभ्यासो भिनडेम्, शौलश्चैते ये क्रियन्तो जना
 भविष्यद्वादिनो उपदेशारश्चान्तियभियानगरस्थमएडव्याम् आसन्, 2 ते
 यदोपवासं कृत्वेश्वरम् असेवन्त तस्मिन् समये पवित्र आत्मा कथितवान्
 अहं यस्मिन् कर्म्मणि बार्णव्वाशौलौ नियुक्तवान् तत्कर्म्म कर्तुं तौ पृथक्
 कुरुत। 3 ततस्तेरुपवासप्रार्थनयोः कृतयोः सतोस्ते तयोर् गार्त्रयोर् हस्तार्पणं
 कृत्वा तौ व्यसृजन्। 4 ततः परं तौ पवित्रेणात्मना प्रेरितौ सन्तौ
 सिलूकियानगरम् उपस्थाय समुद्रपथेन कुप्रोपद्वीपम् अगच्छतां। 5 ततः
 सालामीनगरम् उपस्थाय तत्र यिद्धूदीयानां भजनभवनानि गत्वेश्वरस्य
 कथां प्राचारयतां; योडनपि तत्सहयरोडभवत्। 6 एत्थं ते तस्योपद्वीपस्य
 सर्व्वत्र भ्रमन्तः पाइनगरम् उपस्थिताः; तत्र सुविवेककेन सर्जियपौलनाम्ना
 तद्देशाधिपतिना सह भविष्यद्वादिनो वेशधारी बर्याशुनामा यो मायावी
 यिद्धूदी आसीत् तं साक्षात् प्राप्तवतः। 7 तद्देशाधिप एश्वरस्य कथां श्रोतुं
 वाञ्छन् पौलबार्णव्वा न्यमन्त्रयत्। 8 किन्त्विदुमा यं मायाविनं वदन्ति स
 देशाधिपतिं धर्म्ममार्गाद् बहिर्भूतं कर्तुम् अयतत। 9 तस्मात् शोलोडर्थात्
 पौलः पवित्रेणात्मना परिपूर्णाः सन् तं मायाविनं प्रत्यनन्यदृष्टिं कृत्वाकथयत्,

10 હે નરકિન્ ધર્મદ્વેષિન્ કૌટિલ્યદુષ્કર્મપરિપૂર્ણ, ત્વં કિં પ્રભોઃ સત્યપથસ્ય વિપર્યયકરણાત્ કદાપિ ન નિવર્તિષ્યસે? 11 અધુના પરમેશ્વરસ્તવ સમુચિતં કરિષ્યતિ તેન કતિપયદિનાનિ ત્વમ્ અન્ધઃ સન્ સૂર્યમપિ ન દ્રક્ષ્યસિ | તત્કાણાદ્ રાત્રિવદ્ અન્ધકારસ્તસ્ય દૃષ્ટિમ્ આચ્છાદિતવાન્; તસ્માત્ તસ્ય હસ્તં ધર્તુ સ લોકમન્વિચ્છન્ ઇતસ્તતો ભ્રમાણં કૃતવાન્ | 12 એનાં ઘટનાં દૃષ્ટ્વા સ દેશાધિપતિઃ પ્રભૂપદેશાદ્ વિસ્મિત્ય વિશ્વાસં કૃતવાન્ | 13 તદનન્તરં પૌલસ્તત્સક્ષિન્નૌ ચ પાફનગરાત્ પ્રોતં ચાલયિત્વા પમ્ફુલિયાદેશસ્ય પર્ગીનગરમ્ અગચ્છન્ કિન્તુ યોહન્ તયોઃ સમીપાદ્ એત્ય ચિરૂશાલમં પ્રત્યાગચ્છત્ | 14 પશ્ચાત્ તૌ પર્ગીતો યાત્રાં કૃત્વા પિસિદિયાદેશસ્ય આન્તિયખિયાનગરમ્ ઉપસ્થાય વિશ્રામવારે ભજનભવનં પ્રવિશ્ય સમુપાવિશતાં | 15 વ્યવસ્થાભવિષ્યદ્વાક્યયોઃ પઠિતયોઃ સતો હૈ ભ્રાતરૌ લોકાન્ પ્રતિ યુવયોઃ કાયિદ્ ઉપદેશકથા યદસ્તિ તર્હિ તાં વદતં તૌ પ્રતિ તસ્ય ભજનભવનસ્યાધિપતયઃ કથામ્ એતાં કથયિત્વા પ્રૈષયન્ | 16 અતઃ પૌલ ઉત્તિષ્ઠન્ હસ્તેન સક્રેતં કુર્વન્ કથિતવાન્ હે ઇસ્રાયેલીયમનુષ્યા ઇશ્વરપરાયણાઃ સર્વે લોકા યૂયમ્ અવધદ્ધં | 17 એતેષામિસ્રાયેલ્લોકાનામ્ ઇશ્વરોડસ્માકં પૂર્વપરુષાન્ મનોનીતાન્ કત્વા ગૃહીતવાન્ તતો મિસરિ દેશે પ્રવસનકાલે તેષામુન્નતિં કૃત્વા તસ્માત્ સ્વીયબાહુબલેન તાન્ બહિઃ કૃત્વા સમાનયત્ | 18 યત્વારિંશદ્વત્સરાન્ યાવચ્ચ મહાપ્રાન્તરે તેષાં ભરણં કૃત્વા 19 કિનાન્દેશાન્તર્વર્તીણિ સપ્તરાજ્યાનિ નાશયિત્વા ગુટિકાપાતેન તેષુ સર્વદેશેષુ તેભ્યોડધિકારં દત્તવાન્ | 20 પચ્ચાશદધિકચતુઃશતેષુ વત્સરેષુ ગતેષુ ચ શિમૂયેલ્ભવિષ્યદ્વાદિપર્યન્તં તેષામુપરિ વિચારયિતૃન્ નિયુક્તવાન્ | 21 તૈશ્ચ રાજિ પ્રાર્થિતે, ઇશ્વરો ભિન્યામીનો વંશજાતસ્ય કીશઃ પુત્રં શૌલં યત્વારિંશદ્વર્ષપર્યન્તં તેષામુપરિ રાજાનં કૃતવાન્ | 22 પશ્ચાત્ તં પદચ્યુતં કૃત્વા યો મદિષ્ટક્રિયાઃ સર્વાઃ કરિષ્યતિ તાદૃશં મમ મનોભિમતમ્ એકં જનં ચિશયઃ પુત્રં દાયૂદં પ્રાપ્તવાન્ ઇદં પ્રમાણં યસ્મિન્ દાયૂદિ સ દત્તવાન્ તં દાયૂદં તેષામુપરિ રાજત્વં કર્તુમ્ ઉત્પાદિતવાન | 23 તસ્ય સ્વપ્રતિશ્રુતસ્ય વાક્યસ્યાનુસારેણ ઇસ્રાયેલ્લોકાનાં નિમિત્તં તેષાં મનુષ્યાણાં વંશાદ્ ઇશ્વર એકં યીશું (ત્રાતારમ્) ઉદપાદયત્ | 24 તસ્ય પ્રકાશનાત્ પૂર્વ યોહન્ ઇસ્રાયેલ્લોકાનાં સન્નિધૌ મનઃપરાવર્તનરૂપં મજ્જનં

પ્રાચારયત્ | 25 યસ્ય ચ કર્મણો ભારં પ્રપ્તવાન્ યોહન્ તન્ નિષ્પાદયન્
 એતાં કથાં કથિતવાન્, યૂયં માં કં જનં જાનીથ? અહમ્ અભિષિક્તત્રાતા
 નહિ, કિન્તુ પશ્યત યસ્ય પાદયોઃ પાદુકયો ભન્ધને મોચયિતુમપિ યોગ્યો
 ન ભવામિ તાદૃશ એકો જનો મમ પશ્ચાદ્ ઉપતિષ્ઠતિ | 26 હે ઇબ્રાહીમો
 વંશજાતા ભ્રાતરો હે ઇશ્વરભીતાઃ સર્વલોકા યુષ્માન્ પ્રતિ પરિત્રાણસ્ય
 કથૈષા પ્રેરિતા | 27 ચિરૂશાલમ્નિવાસિનસ્તેષામ્ અધિપતયશ્ચ તસ્ય યીશોઃ
 પરિચયં ન પ્રાપ્ય પ્રતિવિશ્રામવારં પઠયમાનાનાં ભવિષ્યદ્વાદિકથાનામ્
 અભિપ્રાયમ્ અબુદ્ધવા ય તસ્ય વધેન તાઃ કથાઃ સફલા અકુર્વન્ |
 28 પ્રાણહનનસ્ય કમપિ હેતુમ્ અપ્રાપ્યાપિ પીલાતસ્ય નિકટે તસ્ય વધં
 પ્રાર્થયન્ત | 29 તસ્મિન્ યાઃ કથા લિખિતાઃ સન્તિ તદનુસારેણ કર્મ
 સમ્પાદ્ય તં કુશાદ્ અવતાર્ય શ્મશાને શાયિતવન્તઃ | 30 કિન્ત્વીશ્વરઃ
 શ્મશાનાત્ તમુદ્સ્થાપયત્, 31 પુનશ્ચ ગાલીલપ્રદેશાદ્ ચિરૂશાલમનગરં તેન
 સાર્દ્ધં યે લોકા આગચ્છન્ સ બહુદિનાનિ તેભ્યો દર્શનં દત્તવાન્, અતસ્ત
 ઇદાનીં લોકાન્ પ્રતિ તસ્ય સાક્ષિણઃ સન્તિ | 32 અસ્માકં પૂર્વપુરુષાણાં
 સમક્ષમ્ ઇશ્વરો યસ્મિન્ પ્રતિજ્ઞાતવાન્ યથા, ત્વં મે પુત્રોસિ યાદ્ય ત્વાં
 સમુત્થાપિતવાનહમ્ | 33 ઇદં ચદ્વયનં દ્વિતીયગીતે લિખિતમાસ્તે તદ્
 યીશોરુત્થાનેન તેષાં સન્તાના યે વયમ્ અસ્માકં સન્નિઘૌ તેન પ્રત્યક્ષી કૃતં,
 યુષ્માન્ ઇમં સુસંવાદં જ્ઞાપયામિ | 34 પરમેશ્વરેણ શ્મશાનાદ્ ઉત્થાપિતં
 તદીયં શરીરં કદાપિ ન ક્ષેષ્યતે, એતસ્મિન્ સ સ્વયં કથિતવાન્ યથા દાયૂદ્
 પ્રતિ પ્રતિજ્ઞાતો યો વરસ્તમહં તુભ્યં દાસ્યામિ | 35 એતદન્યસ્મિન્ ગીતેડપિ
 કથિતવાન્ | સ્વકીયં પુણ્યવન્તં ત્વં ક્ષયિતું ન ચ દાસ્યસિ | 36 દાયૂદા
 ઇશ્વરાભિમતસેવાયૈ નિજાયુષિ વ્યયિતે સતિ સ મહાનિદ્રાં પ્રાપ્ય નિજૈઃ
 પૂર્વપુરુષૈઃ સહ મિલિતઃ સન્ અક્ષીયત; 37 કિન્તુ યમીશ્વરઃ શ્મશાનાદ્
 ઉદસ્થાપયત્ સ નાક્ષીયત | 38 અતો હે ભ્રાતરઃ, અનેન જનેન પાપમોચનં
 ભવતીતિ યુષ્માન્ પ્રતિ પ્રચારિતમ્ આસ્તે | 39 ફલતો મૂસાવ્યવસ્થયા યૂયં
 યેભ્યો દોષેભ્યો મુક્તા ભવિતું ન શક્ષ્યથ તેભ્યઃ સર્વદોષેભ્ય એતસ્મિન્ જને
 વિશ્વાસિનઃ સર્વે મુક્તા ભવિષ્યન્તીતિ યુષ્માભિ જ્ઞાયાતાં | 40 અપરઞ્ચ |
 અવજ્ઞાકારિણો લોકાશ્ચક્ષુરુન્મીલ્ય પશ્યત | તથૈવાસમ્ભવં જ્ઞાત્વા સ્યાત
 યૂયં વિલજ્જિજતાઃ | યતો યુષ્માસુ તિષ્ઠત્સુ કરિષ્યે કર્મ તાદૃશં | યેનૈવ તસ્ય

वृत्तान्ते युष्मत्प्रत्ययेऽपि ङि । यूयं न तन्तु वृत्तान्तं प्रत्येष्यथ कदायन । |
 41 येयं कथा भविष्यद्वादिनां ग्रन्थेषु लिखितास्ते सावधाना भवत स कथा
 यथा युष्मान् प्रति न घटते । 42 यिद्धूदीयत्भजनभवनान् निर्गतयोस्तयो
 भिन्नदेशीयैर्वक्ष्यमाणानां प्रार्थना कृता, आगामिनि विश्रामवारेऽपि कथेयम्
 अस्मान् प्रति प्रचारिता भवत्विति । 43 सत्माया भङ्गे सति बहवो
 यिद्धूदीयलोका यिद्धूदीयमतग्राहिनो भक्तलोकाश्च बर्णव्यापौलयोः पश्चाद्
 आगच्छन्, तेन तौ तैः सः नानाकथाः कथयित्वेश्वरानुग्रहाश्रये स्थातुं तान्
 प्रावर्तयतां । 44 परविश्रामवारे नगरस्य प्रायेण सर्वे लाका एश्वरीयां
 कथां श्रोतुं मिलिताः, 45 किन्तु यिद्धूदीयलोका जननिवहं विलोक्य ईर्ष्या
 परिपूर्णाः सन्तो विपरीतकथाकथनेनेश्वरनिन्दया य पौलेनोक्तां कथां
 भ्रष्टयितुं चेष्टितवन्तः । 46 ततः पौलबर्णव्यावक्षोभौ कथितवन्तौ
 प्रथमं युष्माकं सन्निधावीश्वरीयकथायाः प्रचारणम् उचितमासीत् किन्तु
 तदग्राह्यत्वकरणेन यूयं स्वान् अनन्तायुषोऽयोग्यान् दर्शयथ, अतत्कारणाद्
 वयम् अन्यदेशीयलोकानां समीपं गच्छामः । (aiōnios g166) 47 प्रभुरस्मान्
 एतथम् आदिष्टवान् यथा, यावद्य जगतः सीमां लोकानां त्राणकारणात् ।
 मयान्यदेशमध्ये त्वं स्थापितो भूः प्रदीपवत् । | 48 तदा कथामीदृशीं श्रुत्वा
 भिन्नदेशीया आह्लादिताः सन्तः प्रभोः कथां धन्यां धन्याम् अवदन्, यावन्तो
 लोकाश्च परमायुः प्राप्तिनिमित्तं निरूपिता आसन् ते व्यश्वसन् । (aiōnios
 g166) 49 एतथं प्रभोः कथा सर्व्वदेशं व्याप्नोत् । 50 किन्तु यिद्धूदीया नगरस्य
 प्रधानपुरुषान् सम्मान्याः कथिपया भक्ता योषितश्च कुप्रवृत्तिं ग्राहयित्वा
 पौलबर्णव्यावक्षोभौ ताडयित्वा तस्मात् प्रदेशाद् दूरीकृतवन्तः । 51 अतः कारणात्
 तौ निजपदधूलीस्तेषां प्रातिकूल्येन पातयित्वेकनियं नगरं गतौ । 52 ततः
 शिष्यगण आनन्देन पवित्रेणात्मना य परिपूर्णोभवत् ।

14 तौ द्वौ जनौ युगपद् एकनियनगरस्थयिद्धूदीयानां भजनभवनं गत्वा
 यथा बहवो यिद्धूदीया अन्यदेशीयलोकाश्च व्यश्वसन् तादृशीं कथां
 कथितवन्तौ । 2 किन्तु विश्वासिनीना यिद्धूदीया अन्यदेशीयलोकान्
 कुप्रवृत्तिं ग्राहयित्वा भ्रातृगणं प्रति तेषां वैरं जनितवन्तः । 3 अतः
 स्वानुग्रहकथायाः प्रमाणं दत्त्वा तयो ईस्तैर्बहुलक्षणाम् अद्भुतकर्म य
 प्राकाशयद् यः प्रभुस्तस्य कथा अक्षोभेन प्रचार्य्य तौ तत्र बहुदिनानि

समवातिष्ठेतां | 4 किन्तु कियन्तो लोका यिडूदीयानां सपक्षाः कियन्तो लोकाः
 प्रेरितानां सपक्षा जाताः, अतो नागरिकजननिवलमध्ये भिन्नवाक्यत्वम्
 अभवत् | 5 अन्यदेशीया यिडूदीयास्तोषाम् अधिपतयश्च दौरात्भ्यं
 कुत्वा तौ प्रस्तरैराहन्तुम् उधताः | 6 तौ तद्द्वार्ता प्राप्य पलायित्वा
 लुकायनियादेशस्थान्तर्वर्तिलुस्त्राहर्षो 7 तत्समीपस्थदेशञ्च गत्वा तत्र
 सुसंवाहं प्रचारयतां | 8 तत्रोभयपाद्योश्चालनशक्तिहीनो जन्मारभ्य भञ्जः
 कदापि गमनं नाकरोत् अेतादृश अेको मानुषो लुस्त्रानगर उपविश्य पौलस्य
 कथां श्रुतवान् | 9 अेतस्मिन् समये पौलस्तभ्रति दृष्टिं कृत्वा तस्य स्वास्थ्ये
 विश्वासं विदित्वा प्रोच्यैः कथितवान् 10 पद्भ्यामुत्तिष्ठन् ऋजु र्भव | ततः
 स उल्लभं कृत्वा गमनागमने कुतवान् | 11 तदा लोकाः पौलस्य तत् कार्यं
 विलोक्य लुकायनीयभाषया प्रोच्यैः कथामेतां कथितवन्तः, देवा मनुष्यरूपं
 धृत्वास्माकं समीपम् अवारोहन् | 12 ते भार्गवां यूपितरम् अवदन् पौलश्च
 भुष्यो वक्ता तस्मात् तं मर्कुरियम् अवदन् | 13 तस्य नगरस्य सम्भुषे
 स्थापितस्य यूपितरविग्रहस्य याजको वृषान् पुष्पमालाश्च द्वारसमीपम्
 आनीय लोकैः सद्धं तावुद्दिश्य समुत्सृज्य दातुम् उधतः | 14 तद्द्वार्ता श्रुत्वा
 भार्गवापौलौ स्वीयवस्त्राणि छित्वा लोकानां मध्यं वेगेन प्रविश्य प्रोच्यैः
 कथितवन्तौ, 15 हे महेच्छाः कुत अेतादृशं कर्म कुरुथ? आवामपि युष्मादृशौ
 सुभद्रुःभोगिनौ मनुष्यौ, युयम् अेताः सर्वा वृथाकल्पनाः परित्यज्य यथा
 गगाणवसुन्धराजलनिधीनां तन्मध्यस्थानां सर्वेषाञ्च स्रष्टारममरम् ईश्वरं
 प्रति परावर्तध्वे तदर्थम् आवां युष्माकं सन्निधौ सुसंवाहं प्रचारयावः | 16
 स ईश्वरः पूर्वकाले सर्वदेशीयलोकान् स्वस्वमार्गे यलितुमनुमतिं दत्तवान्,
 17 तथापि आकाशात् तोयवर्षणेन नानाप्रकारशस्योत्पत्त्या य युष्माकं
 छित्तेषी सन् भक्ष्यैराननदेन य युष्माकम् अन्तःकराणानि तर्पयन् तानि
 दानानि निजसाक्षिस्वरूपाणि स्थपितवान् | 18 किन्तु तादृशायां कथायां
 कथितायामपि तयोः समीप उत्सर्जनात् लोकनिवहं प्रायेण निवर्तयितुं
 नाशक्नुताम् | 19 आन्तियभिया-ईकनियनगराभ्यां कतिपययिडूदीयलोका
 आगत्य लोकान् प्रावर्तयन्त तस्मात् तै पौलं प्रस्तरैराहन् तेन स मृत एति
 विज्ञाय नगरस्य अडिस्तम् आकृष्य नीतवन्तः | 20 किन्तु शिष्यगणे तस्य
 यतुर्दिशि तिष्ठति सति स स्वयम् उत्थाय पुनरपि नगरमध्यं प्राविशत्

तत्पर्येऽहनि बार्णव्यासहितो दूर्वाङ्गनगरं गतवान् | 21 तत्र सुसंवाहं प्रयार्थ्य
 बहुलोकान् शिष्यान् कृत्वा तौ लुम्बिनीम् एकनियम् आन्तियभियाञ्च परावृत्त्य
 गतौ | 22 बहुलुम्बिनीम् लुम्बिनीपीश्वरराज्यं प्रवेष्टव्यम् इति कारणाद्
 धर्ममार्गो स्थातुं विनयं कृत्वा शिष्यगणस्य मनःस्थैर्यम् अकुरुतां | 23
 माण्डलीनां प्राचीनवर्गान् नियुज्य प्रार्थनोपवासौ कृत्वा यत्राभौ ते व्यश्वसन्
 तस्य हस्ते तान् समर्प्य 24 पिसिदियामध्येन पाण्डुलिखादेशं गतवन्तौ | 25
 पश्चात् पर्वानगरं गत्वा सुसंवाहं प्रयार्थ्य अन्तिलियानगरं प्रस्थितवन्तौ | 26
 तस्मात् समुद्रपथेन गत्वा ताभ्यां यत् कर्म सम्पन्नं तत्कर्म साधयितुं यन्नगरे
 द्यालोरीश्वरस्य हस्ते समर्पितौ जातौ तद् आन्तियभियानगरं गतवन्तौ |
 27 तत्रोपस्थाय तन्नगरस्थमाण्डलीं संगृह्य स्वाभ्याम् ईश्वरो यद्यत्
 कर्मकरोत् तथा येन प्रकारेण भिन्नदेशीयलोकान् प्रति विश्वासरूपद्वारम्
 अभोययद् अेतान् सर्व्ववृत्तान्तान् तान् ज्ञापितवन्तौ | 28 ततस्तौ शिष्यैः
 सार्द्धं तत्र बहुलुम्बिनीम् न्यवसताम् |

15 यिदुदादेशात् कियन्तो जना आगत्य भ्रातृगणमित्थं शिक्षितवन्तो
 भूसाव्यवस्थया यद्दि युष्माकं त्वक्छेदो न भवति तर्हि यूयं परित्राणं प्राप्नुं न
 शक्यथ | 2 पौलबार्णवौ तैः सह बहुलुम्बिनीं विचारान् विवादांश्च कृतवन्तौ,
 ततो माण्डलीयनोका अेतस्याः कथायास्तत्त्वं ज्ञातुं यिदुशालमनगरस्थान्
 प्रेरितान् प्राचीनांश्च प्रति पौलबार्णवाप्रभृतीन् कतिपयजनान् प्रेषयितुं
 निश्चयं कृतवन्तः | 3 ते माण्डल्या प्रेरिताः सन्तः द्वेष्णीकीशोमिरोन्देशाभ्यां
 गत्वा भिन्नदेशीयानां मनःपरिवर्त्तनस्य वार्त्तया भ्रातृणां परमाह्लादम्
 अजनयन् | 4 यिदुशालम्युपस्थाय प्रेरितगणेन लोकप्राचीनगणेन
 समाज्जेन य समुपगृहीताः सन्तः स्वैरीश्वरो यानि कर्माणि कृतवान् तेषां
 सर्व्ववृत्तान्तान् तेषां समक्षम् अकथयन् | 5 किन्तु विश्वासिनः कियन्तः
 द्विदुशिमतग्राहिलो लोका उत्थाय कथाभेतां कथितवन्तो भिन्नदेशीयानां
 त्वक्छेदं कर्तुं भूसाव्यवस्थां पालयितुञ्च समादेष्यम् | 6 ततः प्रेरिता
 लोकप्राचीनाश्च तस्य विवेचनां कर्तुं सभायां स्थितवन्तः | 7 बहुलुम्बिनीषु
 जातषु पितर उत्थाय कथितवान्, हे भ्रातरो यथा भिन्नदेशीयलोका मम
 भुभात् सुसंवाहं श्रुत्वा विश्वसन्ति तदर्थं बहुलुम्बिनीम् पूर्व्वम् ईश्वरोस्माकं
 मध्ये मां वृत्वा नियुक्तवान् | 8 अन्तर्यामीश्वरो यथास्मभ्यं तथा

ભિન્નદેશીયેભ્યઃ પવિત્રમાત્માનં પ્રદાય વિશ્વાસેન તેષામ્ અન્તઃકરણાનિ
 પવિત્રાણિ કૃત્વા 9 તેષામ્ અસ્માકઞ્ચ મધ્યે કિમપિ વિશેષં ન સ્થાપયિત્વા
 તાનધિ સ્વયં પ્રમાણં દત્તવાન્ ઇતિ યૂયં જાનીથ | 10 અતએવાસ્માકં
 પૂર્વપુરુષા વયઞ્ચ સ્વયં યદુગસ્ય ભારં સોઢું ન શક્તાઃ સમ્પ્રતિ તં
 શિષ્યગણસ્ય સ્કન્ધેષુ ન્યસિતું કુત ઇશ્વરસ્ય પરીક્ષાં કરિષ્યથ? 11 પ્રભો
 ર્થીશુપ્રીષ્ટસ્યાનુગ્રહેણ તે યથા વયમપિ તથા પરિત્રાણં પ્રાપ્તુમ્ આશાં કુર્મઃ |
 12 અનન્તરં બાર્ણબ્બાપૌલાભ્યામ્ ઇશ્વરો ભિન્નદેશીયાનાં મધ્યે યદદ્
 આશ્રયર્થમ્ અદ્ભુતઞ્ચ કર્મ કૃતવાન્ તદ્ગુતાન્તં તૌ સ્વમુખાભ્યામ્ અવર્ણયતાં
 સભાસ્થાઃ સર્વે નીરવાઃ સન્તઃ શ્રુતવન્તઃ | 13 તયોઃ કથાયાં સમાપ્તાયાં
 સત્યાં યાકૂબ્ કથયિતુમ્ આરબ્ધવાન્ 14 હે ભ્રાતરો મમ કથાયામ્ મનો
 નિધત્ | ઇશ્વરઃ સ્વનામાર્થં ભિન્નદેશીયલોકાનામ્ મધ્યાદ્ એકં લોકસંઘં
 ગ્રહીતું મતિં કૃત્વા યેન પ્રકારેણ પ્રથમં તાન્ પ્રતિ કૃપાવલેકનં કૃતવાન્ તં
 શિમોન્ વર્ણિતવાન્ | 15 ભવિષ્યદ્વાદિભિરુક્તાનિ યાનિ વાક્યાનિ તૈઃ સાર્દ્ધમ્
 એતસ્યૈક્યં ભવતિ યથા લિખિતમાસ્તે | 16 સર્વેષાં કર્મણાં યસ્તુ સાધકઃ
 પરમેશ્વરઃ | સ એવેદં વદેદ્વાક્યં શેષાઃ સકલમાનવાઃ | ભિન્નદેશીયલોકાશ્ચ
 યાવન્તો મમ નામતઃ | ભવન્તિ હિ સુવિખ્યાતાસ્તે યથા પરમેશિતુઃ | 17
 તત્વં સમ્યક્ સમીહન્તે તન્નિમિત્તમહં કિલ | પરાવૃત્ય સમાગત્ય દાયૂદઃ
 પતિતં પુનઃ | દૂષ્યમુત્થાપયિષ્યામિ તદીયં સર્વવસ્તુ ય | પતિતં પુનરુથાપ્ય
 સજ્જયિષ્યામિ સર્વથા | | 18 આ પ્રથમાદ્ ઇશ્વરઃ સ્વીયાનિ સર્વકર્મ્માણિ
 જાનાતિ | (aīṅ g165) 19 અતએવ મમ નિવેદનમિદં ભિન્નદેશીયલોકાનાં
 મધ્યે યે જના ઇશ્વરં પ્રતિ પરાવર્તન્ત તેષામુપરિ અન્યં કમપિ ભારં ન ન્યસ્ય
 20 દેવતાપ્રસાદાશુચિભક્ષ્યં વ્યભિચારકર્મ્મ કણ્ઠસમ્પીડનમારિતપ્રાણિભક્ષ્યં
 રક્તભક્ષ્યઞ્ચ એતાનિ પરિત્યક્તું લિખામઃ | 21 યતઃ પૂર્વકાલતો
 મૂસાવ્યવસ્થાપ્રચારિણો લોકા નગરે નગરે સન્તિ પ્રતિવિશ્રામવારઞ્ચ
 ભજનભવને તસ્યાઃ પાઠો ભવતિ | 22 તતઃ પરં પ્રેરિતગણો લોકપ્રાચીનગણઃ
 સર્વા માણ્ડલી ય સ્વેષાં મધ્યે બર્શબ્બા નામ્ના વિખ્યાતો મનોનીતૌ કૃત્વા
 પૌલબાર્ણબ્બાભ્યાં સાર્દ્ધમ્ આન્તિયખિયાનગરં પ્રતિ પ્રેષણમ્ ઉચિતં બુદ્ધ્વા
 તાભ્યાં પત્રં પ્રેષયન્ | 23 તસ્મિન્ પત્રે લિખિતમિદં, આન્તિયખિયા-સુરિયા-
 કિલિકિયાદેશસ્થભિન્નદેશીયભ્રાતૃગણાય પ્રેરિતગણસ્ય લોકપ્રાચીનગણસ્ય

ब्रातृगणस्य य नमस्कारः | 24 विशेषतोऽस्माकम् आज्ञाम् अप्राप्यापि
 कियन्तो जना अस्माकं मध्याद् गत्वा त्वक्छेदो मूसाव्यवस्था य
 पालयितव्याविति युष्मान् शिक्षयित्वा युष्माकं मनसामस्थैर्यं कृत्वा युष्मान्
 ससन्देहान् अकुर्वन् अंतां कथां वयम् अशृन्म | 25 तत्कारणाद् वयम्
 अेकमन्त्राणाः सन्तः सत्मायां स्थित्वा प्रभो र्यीशुभ्रीष्टस्य नामनिमित्तं
 मृत्युमुजगताभ्यामस्माकं 26 प्रियवर्णव्वापौलाभ्यां सार्द्धं मनोनीतलोकानां
 केषाञ्चिद् युष्माकं सन्निधौ प्रेषणम् उचितं बुद्धवन्तः | 27 अतो यिडूदासीलौ
 युष्मान् प्रति प्रेषितवन्तः, अेतयो भुजाभ्यां सर्व्यां कथां ज्ञास्यथ | 28
 देवताप्रसादभक्ष्यं रक्तभक्ष्यं गलपीडनमारितप्राणिभक्ष्यं व्यभियारकर्म
 येमानि सर्व्याणि युष्माभिस्त्याज्यानि; अेतत्प्रयोजनीयाज्ञाव्यतिरेकेन
 युष्माकम् उपरि त्मारमन्यं न न्यसितुं पवित्रस्यात्मनोऽस्माकञ्च उचितज्ञानम्
 अभवत् | 29 अतअेव तेभ्यः सर्व्येभ्यः स्वेषु रक्षितेषु यूयं तद्रं कर्म
 करिष्यथ | युष्माकं मङ्गलं भूयात् | 30 ते विसृष्टाः सन्त आन्तियभियानगर
 उपस्थाय लोकनिवहं संगृह्य पत्रम् अददन् | 31 ततस्ते तत्पत्रं पठित्वा
 सान्त्वनां प्राप्य सानन्दा अभवन् | 32 यिडूदासीलौ य स्वयं प्रयारकौ
 भूत्वा ब्रातृगणं नानोपदिश्य तान् सुस्थिरान् अकुरुताम् | 33 एत्थं
 तौ तत्र तैः साकं कतिपयदिनानि यापयित्वा पश्चात् प्रेरितानां समीपे
 प्रत्यागमनार्थं तेषां सन्निधेः डव्याणेन विसृष्टावभवतां | 34 किन्तु सीलस्तत्र
 स्थातुं वाञ्छितवान् | 35 अपरं पौलवर्णव्वाभौ बडवः शिष्याश्च लोकान्
 उपदिश्य प्रभोः सुसंवाहं प्रयारयन्त आन्तियभियायां कालं यापितवन्तः |
 36 कतिपयदिनेषु गतेषु पौलो वर्णव्वाभौ अवदत् आगच्छावां येषु
 नगरेष्वीश्वरस्य सुसंवाहं प्रयारितवन्तौ तानि सर्व्वनगराणि पुनर्गत्वा
 ब्रातरः कीदृशाः सन्तीति द्रष्टुं तान् साक्षात्कुर्व्वः | 37 तेन मार्कनाम्ना विप्यातं
 योहनं सङ्गिनं कर्तुं वर्णव्वा मतिमकरोत्, 38 किन्तु स पूर्व्वं ताभ्यां सड
 कार्थार्थं न गत्वा पाम्कूलियादेशे तौ त्यक्तवान् तत्कारणात् पौलस्तं सङ्गिनं
 कर्तुम् अनुयितं ज्ञातवान् | 39 एत्थं तयोरतिशयविरोधस्योपस्थितत्वात्
 तौ परस्परं पृथगभवतां ततो वर्णव्वा मार्कं गृहीत्वा पोतेन कुप्रोपद्वीपं
 गतवान्; 40 किन्तु पौलः सीलं मनोनीतं कृत्वा ब्रातृभिरीश्वरानुग्रहे

समर्पितः सन् प्रस्थाय 41 सुरियाकिविकियादेशाभ्यां माण्डलीः स्थिरीकुर्वन्
अगच्छत् |

16 पौलो दूर्बालुस्त्रानगरयोरुपस्थितोभवत् तत्र तीमथियनामा शिष्य
अेक आसीत्; स विश्वासिन्या यिडूदीयाया योषितो गर्भजातः किन्तु
तस्य पितान्यदेशीयलोकः | 2 स जनो लुस्त्रा-छकनियनगरस्थानां ब्रातृणां
समीपेपि सुभ्यातिमान् आसीत् | 3 पौलस्तं स्वसङ्गिनं कर्तुं मतिं कृत्वा तं
गृहीत्वा तद्देशनिवासिनां यिडूदीयानाम् अनुरोधान् तस्य त्वच्छेदं कृतवान्
यतस्तस्य पिता भिन्नदेशीयलोकं गतिं सर्व्वैरज्ञायत | 4 ततः परं ते
नगरे नगरे भ्रमित्वा यिडूशालमस्थैः प्रेरितै लोकाप्राथीनैश्च निरूपितं यद्
व्यवस्थापत्रं तदनुसारेणायरितुं लोकेभ्यस्तद् दत्तवन्तः | 5 तेनैव सर्व्वे
धर्मसमाजाः प्रीष्टधर्मो सुस्थिराः सन्तः प्रतिदिनं वर्द्धिता अभवन् | 6 तेषु
कुगियागालातियादेशमध्येन गतेषु सत्सु पवित्र आत्मा तान् आशियादेशे
कथां प्रकाशयितुं प्रतिषिद्धवान् | 7 तथा मुसियादेश उपस्थाय बिथुनियां
गन्तुं तैरुधोगे कृते आत्मा तान् नान्वमन्यत | 8 तस्मात् ते मुसियादेशं
परित्यज्य त्रोयानगरं गत्वा समुपस्थिताः | 9 रात्रौ पौलः स्वप्ने दृष्टवान्
अेको माकिदनियलोकस्तिष्ठन् विनयं कृत्वा तस्मै कथयति, माकिदनियादेशम्
आगत्यास्मान् उपकुर्व्विति | 10 तस्येत्थं स्वप्नदर्शनात् प्रभुस्तद्देशीयलोकान्
प्रति सुसंवाहं प्रचारयितुम् अस्मान् आहूयतीति निश्चितं बुद्ध्वा वयं तूर्णं
माकिदनियादेशं गन्तुम् उद्योगम् अकुर्म | 11 ततः परं वयं त्रोयानगराद्
प्रस्थाय ऋजुमार्गेण सामथ्राकियोपद्वीपेन गत्वा परेडलनि नियापलिनगर
उपस्थिताः | 12 तस्माद् गत्वा माकिदनियान्तर्व्वर्त्ति रोभीयवसतिस्थानं यत्
ड्रिलिपीनामप्रधाननगरं तत्रोपस्थाय कतिपयदिनानि तत्र स्थितवन्तः | 13
विश्रामवारे नगराद् बहिर्गत्वा नदीतटे यत्र प्रार्थनायार आसीत् तत्रोपविश्य
समागता नारीः प्रति कथां प्राचारयाम | 14 ततः थुयातीरानगरीया
धूषराम्बरविकायिणी लुटियानामिका या ईश्वरसेविका योषित् श्रोत्रीणां
मध्ये आसीत् तथा पौलोकतवाक्यानि यद् गृह्यन्ते तदर्थं प्रभुस्तस्या मनोद्वारं
मुक्तवान् | 15 अतः सा योषित् सपरिवारा मञ्जिता सती विनयं
कृत्वा कथितवती, युष्माकं विचाराद् यदि प्रभौ विश्वासिनी जाताहं तर्हि
मम गृहम् आगत्य तिष्ठत | इत्थं सा यत्नेनास्मान् अस्थापयत् | 16

યસ્યા ગણનયા તદધિપતીનાં બહુધનોપાર્જનં જાતં તાદૃશી ગણકભૂતગ્રસ્તા
 કાયન દાસી પ્રાર્થનાસ્થાનગમનકાલ આગત્યાસ્માન્ સાક્ષાત્ કૃતવતી | 17
 સાસ્માકં પૌલસ્ય ચ પશ્ચાદ્ એત્ય પ્રોચ્યૈઃ કથામિમાં કથિતવતી, મનુષ્યા
 એતે સર્વોપરિસ્થસ્યેશ્વરસ્ય સેવકાઃ સન્તોડસ્માન્ પ્રતિ પરિત્રાણસ્ય
 માર્ગં પ્રકાશયન્તિ | 18 સા કન્યા બહુદિનાનિ તાદૃશમ્ અકરોત્ તસ્માત્
 પૌલો દુઃખિતઃ સન્ મુખં પરાવર્ત્ય તં ભૂતમવદદ્, અહં ચીશુપ્ત્રીષ્ટસ્ય નામ્ના
 ત્વામાજ્ઞાપયામિ ત્વમસ્યા બહિર્ગચ્છ; તેનૈવ તત્ક્ષણાત્ સ ભૂતસ્તસ્યા
 બહિર્ગતઃ | 19 તતઃ સ્વેષાં લાભસ્ય પ્રત્યાશા વિફલા જાતેતિ વિલોક્ય
 તસ્યાઃ પ્રભવઃ પૌલં સીલઞ્ચ ધૃત્વાકૃષ્ય વિચારસ્થાનેડધિપતીનાં સમીપમ્
 આનયન્ | 20 તતઃ શાસકાનાં નિકટં નીત્વા રોમિલોકા વયમ્ અસ્માકં
 યદ્ વ્યવહરણં ગ્રહીતુમ્ આચરિતુઞ્ચ નિષિદ્ધં, 21 ઇમે ચિહ્નૈયલોકાઃ
 સન્તોપિ તદેવ શિક્ષયિત્વા નગરેડસ્માકમ્ અતીવ કલહં કુર્વન્તિ, 22 ઇતિ
 કથિતે સતિ લોકનિવહસ્તયોઃ પ્રાતિકૂલ્યેનોદતિષ્ઠત્ તથા શાસકાસ્તયો
 વસ્ત્રાણિ છિત્વા વેત્રાઘાતં કર્તુમ્ આજ્ઞાપયન્ | 23 અપરં તે તૌ બહુ
 પ્રહાર્યં ત્વમેતૌ કારાં નીત્વા સાવધાનં રક્ષયેતિ કારારક્ષકમ્ આદિશન્ | 24
 ઇત્યમ્ આજ્ઞાં પ્રાપ્ય સ તાવભ્યન્તરસ્થકારાં નીત્વા પાદેષુ પાદપાશીભિ
 ભદ્ધ્વા સ્થાપિતાવાન્ | 25 અથ નિશીથસમયે પૌલસીલાવીશ્વરમુદ્દિશ્ય
 પ્રાથનાં ગાનઞ્ચ કૃતવન્તૌ, કારાસ્થિતા લોકાશ્ચ તદશૃણવન્ 26 તદાકસ્માત્
 મહાન્ ભૂમિકમ્પોડભવત્ તેન ભિન્તિમૂલેન સહ કારા કમ્પિતાભૂત્ તત્ક્ષણાત્
 સર્વાણિ દ્વારાણિ મુક્તાનિ જાતાનિ સર્વેષાં બન્ધનાનિ ચ મુક્તાનિ | 27
 અતએવ કારારક્ષકો નિદ્રાતો જાગરિત્વા કારાયા દ્વારાણિ મુક્તાનિ દૃષ્ટ્વા
 બન્દિલોકાઃ પલાયિતા ઇત્યનુમાય કોષાત્ ખડ્ગં બહિઃ કૃત્વાત્મઘાતં કર્તુમ્
 ઉદ્યતઃ | 28 કિન્તુ પૌલઃ પ્રોચ્યેસ્તમાહૂય કથિતવાન્ પશ્ય વયં સર્વેડત્રાસ્મહે,
 ત્વં નિજપ્રાણહિંસાં માકાર્ષીઃ | 29 તદા પ્રદીપમ્ આનેતુમ્ ઉક્ત્વા સ
 કમ્પમાનઃ સન્ ઉલ્લમ્બ્યાભ્યન્તરમ્ આગત્ય પૌલસીલયોઃ પાદેષુ પતિતવાન્ |
 30 પશ્ચાત્ સ તૌ બહિરાનીય પૃષ્ટવાન્ હે મહેચ્છૌ પરિત્રાણં પ્રાપ્તું મયા
 કિં કર્તવ્યં? 31 પશ્ચાત્ તૌ સ્વગૃહમાનીય તયોઃ સમ્મુખે ખાધદ્રવ્યાણિ
 સ્થાપિતવાન્ તથા સ સ્વયં તદીયાઃ સર્વે પરિવારાશ્ચેશ્વરે વિશ્વસન્તઃ
 સાનન્દિતા અભવન્ | 32 તસ્મૈ તસ્ય ગૃહસ્થિતસર્વલોકેભ્યશ્ચ પ્રભોઃ કથાં

कथितवन्तौ। 33 तथा रात्रेस्तस्मिन्नेव दण्डे स तौ गृहीत्वा तयोः प्रहाराणां
 क्षतानि प्रक्षालितवान् ततः स स्वयं तस्य सर्व्वं परिजनाश्च मञ्जिता
 अभवन्। 34 पश्चात् तौ स्वगृहमानीय तयोः सम्भुजे षाधद्रव्याणि
 स्थापितवान् तथा स स्वयं तदीयाः सर्व्वं परिवाराश्वेश्वरे विश्वसन्तः
 सानन्दिता अभवन्। 35 दिन उपस्थिते तौ लोकौ भोययेति कथां कथयितुं
 शासकाः पदातिगाणं प्रेषितवन्तः। 36 ततः कारारक्षकः पौलाय तां वार्त्तां
 कथितवान् युवां त्याजयितुं शासका लोकान प्रेषितवन्त एदानीं युवां बहि
 र्भूत्वा कुशलेन प्रतिष्ठेतां। 37 किन्तु पौलस्तान् अवदत् रोमिलोकयोरवयोः
 कमपि दोषम् न निश्चित्य सर्व्वेषां समक्षम् आवां कशया ताडयित्वा
 कारायां बद्धवन्त एदानीं किमावां गुप्तं विस्त्रक्ष्यन्ति? तन्न भविष्यति,
 स्वयमागत्यावां बहिः कृत्वा नयन्तु। 38 तदा पदातिभिः शासकेभ्य
 अेतद्वार्त्तायां कथितायां तौ रोमिलोकाविति कथां श्रुत्वा ते भीताः 39
 सन्तस्तयोः सन्निधिमागत्य विनयम् अकुर्व्वन् अपरं बहिः कृत्वा नगरात्
 प्रस्थातुं प्रार्थितवन्तः। 40 ततस्तौ काराया निर्गत्य लुट्टियाया गृहं गतवन्तौ
 तत्र भ्रातृगाणं साक्षात्कृत्य तान् सान्त्वयित्वा तस्मात् स्थानात् प्रस्थितौ।

17 पौलसीलौ आम्फिपल्यापल्लोनियानगराभ्यां गत्वा यत्र यिडूटीयानां
 भजनभवनमेकम् आस्ते तत्र थिषलनीकीनगर उपस्थितौ। 2 तदा
 पौलः स्वायारानुसारेण तेषां समीपं गत्वा विश्रामवारत्रये तैः सार्द्धं
 धर्मपुस्तकीयकथाया विचारं कृतवान्। 3 इलतः श्रीष्टेन दुःभभोगः
 कर्त्तव्यः श्मशानदुत्थानञ्च कर्त्तव्यं युष्माकं सन्निधौ यस्य यीशोः प्रस्तावं
 करोमि स एश्वरेणाभिषिक्तः स अेताः कथाः प्रकाश्य प्रमाणां दत्वा
 स्थिरीकृतवान्। 4 तस्मात् तेषां कतिपयजना अन्यदेशीया बलवो
 भक्तलोका बह्यः प्रधाननार्थ्यश्च विश्वस्य पौलसीलयोः पश्चाद्गामिनो
 जाताः। 5 किन्तु विश्वासलीना यिडूटीयलोका एर्ष्या परिपूर्णाः सन्तो
 उट्टस्य कतिनयलम्पटलोकान् सङ्गिनः कृत्वा जनतया नगरमध्ये मलाकलदं
 कृत्वा यासोनो गृहम् आक्रम्य प्रेरितान् धृत्वा लोकनिवडस्य समीपम्
 आनेतुं येष्टितवन्तः। 6 तेषामुद्देशम् अप्राप्य य यासोनं कतिपयान्
 भ्रातृश्च धृत्वा नगराधिपतीनां निकटमानीय प्रोच्यैः कथितवन्तो ये
 मनुष्या जगद्दुष्टितवन्तस्ते ऽत्राप्युपस्थिताः सन्ति, 7 अेष यासोन्

આતિથ્યં કૃત્વા તાન્ ગૃહીતવાન્ | યીશુનામક એકો રાજસ્તીતિ કથયન્તસ્તે
 કૈસરસ્યાજ્ઞાવિરુદ્ધં કર્મ કુર્વતિ | 8 તેષાં કથામિમાં શ્રુત્વા લોકનિવહો
 નગરાધિપતયશ્ચ સમુદ્વિગ્ના અભવન્ | 9 તદા યાસોનસ્તદન્યેષાઞ્ચ ધનદણ્ડં
 ગૃહીત્વા તાન્ પરિત્યક્તવન્તઃ | 10 તતઃ પરં ભ્રાતૃગણો રજન્યાં પૌલસીલૌ
 શીઘ્રં બિરયાનગરં પ્રેષિતવાન્ તૌ તત્રોપસ્થાય ચિહ્નૂદીયાનાં ભજનભવનં
 ગતવન્તૌ | 11 તત્રસ્થા લોકાઃ થિષલનીકીસ્થલોકેભ્યો મહાત્માન આસન્
 યત ઇત્યં ભવતિ ન વેતિ જ્ઞાતું દિને દિને ધર્મગ્રન્થસ્યાલોચનાં કૃત્વા સ્વૈરં
 કથામ્ અગૃહ્ણન્ | 12 તસ્માદ્ અનેકે ચિહ્નૂદીયા અન્યદેશીયાનાં માન્યા
 સ્ત્રિયઃ પુરુષાશ્ચાનેકે વ્યશ્વસન્ | 13 કિન્તુ બિરયાનગરે પૌલેનેશ્વરીયા
 કથા પ્રચાર્યત ઇતિ થિષલનીકીસ્થા ચિહ્નૂદીયા જ્ઞાત્વા તત્સ્થાનમધ્યાગત્ય
 લોકાનાં કુપ્રવૃત્તિમ્ અજનયન્ | 14 અતએવ તસ્માત્ સ્થાનાત્ સમુદ્રેણ
 યાન્તીતિ દર્શયિત્વા ભ્રાતરઃ ક્ષિપ્રં પૌલં પ્રાહિણવન્ કિન્તુ સીલતીમથિયૌ
 તત્ર સ્થિતવન્તૌ | 15 તતઃ પરં પૌલસ્ય માર્ગદર્શકાસ્તમ્ આથીનીનગર
 ઉપસ્થાપયન્ પશ્ચાદ્ યુવાં તૂર્ણમ્ એતત્ સ્થાનં આગમિષ્યથઃ સીલતીમથિયૌ
 પ્રતીમામ્ આજ્ઞાં પ્રાપ્ય તે પ્રત્યાગતાઃ | 16 પૌલ આથીનીનગરે તાવપેક્ષ્ય
 તિષ્ઠન્ તન્નગરં પ્રતિમાભિઃ પરિપૂર્ણાં દૃષ્ટ્વા સન્તપ્તહૃદયો ડભવત્ |
 17 તતઃ સ ભજનભવને યાન્ ચિહ્નૂદીયાન્ ભક્તલોકાંશ્ચ હૃદ્વે ચ યાન્
 અપશ્યત્ તૈઃ સહ પ્રતિદિનં વિચારિતવાન્ | 18 કિન્તિવપિકૂરીયમતગ્રહિણઃ
 સ્તોત્રિકીયમતગ્રહિણશ્ચ કિયન્તો જનાસ્તેન સાદ્ધ્વં વ્યવદન્ત | તત્ર કેચિદ્
 અકથયન્ એષ વાચાલઃ કિં વક્તુમ્ ઇચ્છતિ? અપરે કેચિદ્ એષ જનઃ
 કેષાન્નિદ્ વિદેશીયદેવાનાં પ્રચારક ઇત્યનુભીયતે યતઃ સ યીશુમ્ ઉત્થિતિઞ્ચ
 પ્રચારયત્ | 19 તે તમ્ અરેયપાગનામ વિચારસ્થાનમ્ આનીય પ્રાવોચન્ ઇદં
 યન્નવીનં મતં ત્વં પ્રાચીકશ ઇદં કીદૃશં એતદ્ અસ્માન્ શ્રાવયઃ | 20 યામિમામ્
 અસમ્ભવકથામ્ અસ્માકં કર્ણગોચરીકૃતવાન્ અસ્યા ભાવાર્થઃ ક ઇતિ
 વયં જ્ઞાતુમ્ ઇચ્છામઃ | 21 તદાથીનીનિવાસિનસ્તન્નગરપ્રવાસિનશ્ચ કેવલં
 કસ્યાશ્ચન નવીનકથાયાઃ શ્રવણેન પ્રચારણેન ચ કાલમ્ અચાપયન્ | 22
 પૌલોડરેયપાગસ્ય મધ્યે તિષ્ઠન્ એતાં કથાં પ્રચારિતવાન્ હે આથીનીયલોકા
 યૂયં સર્વથા દેવપૂજાયામ્ આસક્તા ઇત્યહ પ્રત્યક્ષાં પશ્યામિ | 23
 યતઃ પર્યટનકાલે યુષ્માકં પૂજનીયાનિ પશ્યન્ ‘અવિજ્ઞાતેશ્વરાય’

એતલ્લિપિયુક્તાં યજ્ઞવેદીમેકાં દૃષ્ટવાનઃ; અતો ન વિદિત્વા યં પૂજયધ્વે તસ્યૈવ
 તત્વં યુષ્માન્ પ્રતિ પ્રચારયામિ | 24 જગતો જગત્સ્થાનાં સર્વવસ્તૂનાઞ્ચ
 સૃષ્ટા ય ઈશ્વરઃ સ સર્વગૃધિવ્યોરેકાધિપતિઃ સન્ કરનિર્મિતમન્દિરેષુ ન
 નિવસતિ; 25 સ એવ સર્વોભ્યો જીવનં પ્રાણાન્ સર્વસામગ્રીશ્ચ પ્રદદાતિ;
 અતએવ સ કસ્યાશ્ચિત્ સામગ્રા અભાવહેતો મનુષ્યાણાં હસ્તૈઃ સેવિતો
 ભવતીતિ ન | 26 સ ભૂમણ્ડલે નિવાસાર્થમ્ એકસ્માત્ શોણિતાત્ સર્વાન્
 મનુષ્યાન્ સૃષ્ટ્વા તેષાં પૂર્વનિરૂપિતસમયં વસતિસીમાઞ્ચ નિરચિનોત્; 27
 તસ્માત્ લોકૈઃ કેનાપિ પ્રકારેણ મૃગયિત્વા પરમેશ્વરસ્ય તત્વં પ્રાપ્તું તસ્ય
 ગવેષણં કરણીયમ્ | 28 કિન્તુ સોડસ્માકં કસ્માચ્ચિદપિ દૂરે તિષ્ઠતીતિ
 નહિ, વયં તેન નિશ્વસનપ્રશ્વસનગમનાગમનપ્રાણધારણાનિ કુર્મઃ, પુનશ્ચ
 યુષ્માકમેવ કતિપયાઃ કવયઃ કથયન્તિ 'તસ્ય વંશા વયં સ્મો હિ' ઇતિ | 29
 અતએવ યદિ વયમ્ ઈશ્વરસ્ય વંશા ભવામસ્તર્હિ મનુષ્યૈ વિધયા કૌશલેન ય
 તક્ષિતં સ્વાર્ણં રૂપ્યં દૃષદ્ વૈતેષામીશ્વરત્વમ્ અસ્માભિ ન જ્ઞાતવ્યં | 30 તેષાં
 પૂર્વીયલોકાનામ્ અજ્ઞાનતાં પ્રતીશ્વરો યદપિ નાવાધત્ તથાપીદાનીં સર્વત્ર
 સર્વાન્ મનઃ પરિવર્તયિતુમ્ આજ્ઞાપયતિ, 31 યતઃ સ્વનિયુક્તેન પુરુષેણ
 યદા સ પૃથિવીસ્થાનાં સર્વલોકાનાં વિચારં કરિષ્યતિ તદિનં ન્યરૂપયત્; તસ્ય
 શ્મશાનોત્થાપનેન તસ્મિન્ સર્વોભ્યઃ પ્રમાણં પ્રાદાત્ | 32 તદા શ્મશાનાદ્
 ઉત્થાનસ્ય કથાં શ્રુત્વા કેચિદ્ ઉપાહમન્, કેચિદવદન્ એનાં કથાં પુનરપિ
 ત્વતઃ શ્રોષ્યામઃ | 33 તતઃ પૌલસ્તેષાં સમીપાત્ પ્રસ્થિતવાન્ | 34 તથાપિ
 કેચિલ્લોકાસ્તેન સાદ્ધર્મિલિત્વા વ્યશ્વસન્ તેષાં મધ્યે ડરેયપાગીયદિયનુસિયો
 દામારીનામા કાચિન્નારી કિયન્તો નરાશ્ચાસન્ |

18 તદ્દટનાતઃ પરં પૌલ આથીનીનગરાદ્ યાત્રાં કૃત્વા કરિન્થનગરમ્
 આગચ્છત્ | 2 તસ્મિન્ સમયે કલૌદિયઃ સર્વાન્ ચિહ્નૈયાન્ રોમાનગરં
 વિહાય ગન્તુમ્ આજ્ઞાપયત્, તસ્માત્ પ્રિસ્કિલ્લાનામ્ના જાયયા સાદ્ધર્મ
 ઇતાલિયાદેશાત્ કિઞ્ચિત્પૂર્વમ્ આગમત્ યઃ પન્તદેશે જાત આક્કિલનામા
 ચિહ્નૈયલોકઃ પૌલસ્તં સાક્ષાત્ પ્રાપ્ય તયોઃ સમીપમિતવાન્ | 3 તૌ
 દૂષ્યનિર્માણજીવિનૌ, તસ્માત્ પરસ્પરમ્ એકવૃત્તિકત્વાત્ સ તાભ્યાં
 સહ ઉષિત્વા તત્ કર્માકરોત્ | 4 પૌલઃ પ્રતિવિશ્રામવારં ભજનભવનં
 ગત્વા વિચારં કૃત્વા ચિહ્નૈયાન્ અન્યદેશીયાંશ્ચ પ્રવૃત્તિં ગ્રાહિતવાન્ | 5

सीलतीमथिययो मॉकिदनियादेशात् समेतयोः सतोः पौल उतप्तमना
 भूत्वा थीशुरीश्वरेणामिषिकतो भवतीति प्रमाणं यिडूदीयानां समीपे
 प्रादात्। 6 किन्तु ते ऽतीव विरोधं विधाय पाषण्डीयकथां कथितवन्तस्ततः
 पौलो वस्त्रं धुन्वन् अेतां कथां कथितवान्, युष्माकं शोणितपातापराधो
 युष्मान् प्रत्येव भवतु, तेनाहं निरपराधो ऽधारत्स्य भिन्नदेशीयानां समीपं
 यामि। 7 स तस्मात् प्रस्थाय भजनभवनसमीपस्थस्य युस्तनाम्न
 ऽश्वरभक्तस्य भिन्नदेशीयस्य निवेशनं प्राविशत्। 8 ततः क्रीष्णनामा
 भजनभवनाधिपतिः सपरिवारः प्रभौ व्यश्वसीत्, करिन्थनगरीया बडवो
 लोकाश्च समाकर्ण्य विश्वस्य मञ्जिता अभवन्। 9 क्षणदायां प्रभुः
 पौलं दर्शनं दत्वा भाषितवान्, मा लैषीः, मा निरसीः कथां प्रयारय।
 10 अहं त्वया सार्द्धम् आस हिसार्थं कोपि त्वां स्मृष्टुं न शक्यति
 नगरेऽस्मिन् मदीया लोका बडव आसते। 11 तस्मात् पौलस्तन्नगरे प्रायेण
 सार्द्धवत्सरपर्यन्तं संस्थायेश्वरस्य कथाम् उपादिशत्। 12 गाल्लियनामा
 कश्चिद् आभायादेशस्य प्राड्विवाकः समभवत्, ततो यिडूदीया अेकवाक्याः
 सन्तः पौलम् आक्रम्य विचारस्थानं नीत्वा 13 मानुष अेष व्यवस्थाय
 विरुद्धम् ऽश्वरभजनं कर्तुं लोकान् कुप्रवृत्तिं ग्राहयतीति निवेदितवन्तः। 14
 ततः पौले प्रत्युत्तरं दातुम् उधते सति गाल्लिया यिडूदीयान् व्याहरत्, यद्वि
 कस्यचिद् अन्यायस्य वातिशयदृष्टतायरास्य विचारोऽभविष्यत् तर्हि
 युष्माकं कथा मया सडनीयाभविष्यत्। 15 किन्तु यद्वि केवलं कथाया वा
 नाम्नो वा युष्माकं व्यवस्थाया विवादो भवति तर्हि तस्य विचारमहं न
 करिष्यामि, यूयं तस्य मीमांसां कुरुत। 16 ततः स तान् विचारस्थानाद्
 दूरीकृतवान्। 17 तदा भिन्नदेशीयाः सोस्थिनिनामानं भजनभवनस्य
 प्रधानाधिपतिं धृत्वा विचारस्थानस्य सम्भुजे प्राडरन् तथापि गाल्लिया तेषु
 सर्वकर्मसु न मनो न्यदधात्। 18 पौलस्तत्र पुनर्बहुदिनानि न्यवसत्,
 ततो ब्रातृगणान् विसर्जनं प्राप्य किञ्चनव्रतनिमित्तं किंक्रियानगरे शिरो
 मुण्डयित्वा प्रिस्केल्लाक्किलाभ्यां सडितो जलपथेन सुरियादेशं गतवान्।
 19 तत ऽकिष्णनगर उपस्थाय तत्र तौ विसृज्य स्वयं भजनभवनं प्रविश्य
 यिडूदीयैः सह विचारितवान्। 20 ते स्वैः सार्द्धं पुनः कतिपयदिनानि
 स्थातुं तं व्यनयन्, स तदनुरीकृत्य कथामेतां कथितवान्, 21 यिडूशालमि

આગામ્યુત્સવપાલનાર્થં મયા ગમનીયં; પશ્ચાદ્ ઇશ્વરેચ્છાયાં જાતાયાં યુષ્માકં સમીપં પ્રત્યાગમિષ્યામિ | તતઃ પરં સ તૈર્વિસૃષ્ટઃ સન્ જલપથેન ઇક્ષિષનગરાત્ પ્રસ્થિતવાન્ | 22 તતઃ કૈસરિયામ્ ઉપસ્થિતઃ સન્ નગરં ગત્વા સમાજં નમસ્કૃત્ય તસ્માદ્ આન્તિયખિયાનગરં પ્રસ્થિતવાન્ | 23 તત્ર કિયત્કાલં યાપયિત્વા તસ્માત્ પ્રસ્થાય સર્વેષાં શિષ્યાણાં મનાંસિ સુસ્થિરાણિ કૃત્વા ક્રમશો ગલાતિયાકુગિયાદેશયો ભ્રમિત્વા ગતવાન્ | 24 તસ્મિન્નેવ સમયે સિકન્દરિયાનગરે જાત આપલ્લોનામા શાસ્ત્રવિત્ સુવક્તા યિહૂદીય એકો જન ઇક્ષિષનગરમ્ આગતવાન્ | 25 સ શિક્ષિતપ્રભુમાર્ગો મનસોધોગી ચ સન્ યોહનો મજ્જનમાત્રં જ્ઞાત્વા યથાર્થતયા પ્રભોઃ કથાં કથયન્ સમુપાદિશત્ | 26 એષ જનો નિર્ભયત્વેન ભજનભવને કથયિતુમ્ આરબ્ધવાન્, તતઃ પ્રિસ્કિલ્લાકિક્કલૌ તસ્યોપદેશકથાં નિશમ્ય તં સ્વયોઃ સમીપમ્ આનીય શુદ્ધરૂપેણેશ્વરસ્ય કથામ્ અબોધયતામ્ | 27 પશ્ચાત્ સ આખ્યાદેશં ગન્તું મર્તિં કૃતવાન્, તદા તત્રત્યઃ શિષ્યગણો યથા તં ગૃહ્ણાતિ તદર્થં ભ્રાતૃગણેન સમાશ્વસ્ય પત્રે લિખિતે સતિ, આપલ્લાસ્ત્રોપસ્થિતઃ સન્ અનુગ્રહેણ પ્રત્યયિનાં બહૂપકારાન્ અકરોત્, 28 ફલતો યીશુરભિષિક્તસ્ત્રાતેતિ શાસ્ત્રપ્રમાણં દત્વા પ્રકાશરૂપેણ પ્રતિપન્નં કૃત્વા યિહૂદીયાન્ નિરુત્તરાન્ કૃતવાન્ |

19 કરિન્થનગર આપલ્લસઃ સ્થિતિકાલે પૌલ ઉત્તરપ્રદેશૈરાગચ્છન્ ઇક્ષિષનગરમ્ ઉપસ્થિતવાન્ | તત્ર કતિપયશિષ્યાન્ સાક્ષત્ પ્રાપ્ય તાન્ અપૃચ્છત્, 2 યૂયં વિશ્વસ્ય પવિત્રમાત્માનં પ્રાપ્તા ન વા? તતસ્તે પ્રત્યવદન્ પવિત્ર આત્મા દીયતે ઇત્યસ્મામિઃ શ્રુતમપિ નહિ | 3 તદા સાડવદત્ તર્હિ યૂયં કેન મજ્જિજતા અભવત? તેડકથયન્ યોહનો મજ્જનેન | 4 તદા પૌલ ઉક્તવાન્ ઇતઃ પરં ચ ઉપસ્થાસ્યતિ તસ્મિન્ અર્થત યીશુપ્રીષ્ટે વિશ્વસિતવ્યમિત્યુક્ત્વા યોહન્ મનઃપરિવર્તનસૂચકેન મજ્જનેન જલે લોકાન્ અમજ્જયત્ | 5 તાદૃશીં કથાં શ્રુત્વા તે પ્રભો ર્યાશુપ્રીષ્ટસ્ય નામ્ના મજ્જિજતા અભવન્ | 6 તતઃ પૌલેન તેષાં ગાત્રેષુ કરેડર્પિતે તેષામુપરિ પવિત્ર આત્માવરૂઢવાન્, તસ્માત્ તે નાનાદેશીયા ભાષા ભવિષ્યત્કથાશ્ચ કથિતવન્તઃ | 7 તે પ્રાયેણ દ્વાદશજના આસન્ | 8 પૌલો ભજનભવનં ગત્વા પ્રાયેણ માસત્રયમ્ ઇશ્વરસ્ય રાજ્યસ્ય વિચારં કૃત્વા લોકાન્ પ્રવર્ત્ય

સાહસેન કથામકથયત્ | 9 કિન્તુ કઠિનાન્તઃ કરણત્વાત્ કિયન્તો જના ન
 વિશ્વસ્ય સર્વેષાં સમક્ષમ્ એતત્પથસ્ય નિન્દાં કર્તુ પ્રવૃત્તાઃ, અતઃ પૌલસ્તેષાં
 સમીપાત્ પ્રસ્થાય શિષ્યગણં પૃથક્કૃત્વા પ્રત્યહં તુરાન્નનામ્નઃ કસ્યચિત્
 જનસ્ય પાઠશાલાયાં વિચારં કૃતવાન્ | 10 ઇત્યં વત્સરદ્વયં ગતં તસ્માદ્
 આશિયાદેશનિવાસિનઃ સર્વે ચિહ્નૂદીયા અન્યદેશીયલોકાશ્ચ પ્રભો ર્થીશોઃ
 કથામ્ અશ્રૌષન્ | 11 પૌલેન ચ ઇશ્વર એતાદૃશાન્યદ્દુતાનિ કર્માણિ કૃતવાન્
 12 યત્ પરિઘેયે ગાત્રમાર્જનવસ્ત્રે વા તસ્ય દેહાત્ પીડિતલોકાનામ્ સમીપમ્
 આનીતે તે નિરામયા જાતા અપવિત્રા ભૂતાશ્ચ તેભ્યો બહિર્ગતવન્તઃ | 13 તદા
 દેશાટનકારિણઃ કિયન્તો ચિહ્નૂદીયા ભૂતાપસારિણો ભૂતગ્રસ્તનોકાનાં સન્નિધૌ
 પ્રભે ર્થીશો નામિ જપ્ત્વા વાક્યમિદમ્ અવદન્, યસ્ય કથાં પૌલઃ પ્રચારયતિ
 તસ્ય યીશો નામ્ના યુષ્માન્ આજ્ઞાપયામઃ | 14 સ્કિવનામ્નો ચિહ્નૂદીયાનાં
 પ્રધાનયાજકસ્ય સપ્તભિઃ પુતૈસ્તથા કૃતે સતિ 15 કશ્ચિદ્ અપવિત્રો ભૂતઃ
 પ્રત્યુદિતવાન્, યીશું જાનામિ પૌલઃ પરિચિનોમિ કિન્તુ કે યૂયં? 16
 ઇત્યુક્ત્વા સોપવિત્રભૂતગ્રસ્તો મનુષ્યો લમ્કં કૃત્વા તેષામુપરિ પતિત્વા બલેન
 તાન્ જિતવાન્, તસ્માત્તે નગ્નાઃ ક્ષતાજ્ઞાશ્ચ સન્તસ્તસ્માદ્ ગેહાત્ પલાયન્ત |
 17 સા વાગ્ ઇક્ષિષનગરનિવાસિનસં સર્વેષાં ચિહ્નૂદીયાનાં ભિન્નદેશીયાનાં
 લોકાનાઞ્ચ શ્રવોગોચરીભૂતાઃ; તતઃ સર્વે ભયં ગતાઃ પ્રભો ર્થીશો નામ્નો યશો
 ડવર્દ્ધત | 18 યેષામનેકેષાં લોકાનાં પ્રતીતિરજાયત ત આગત્ય સ્વૈઃ કૃતાઃ
 ક્રિયાઃ પ્રકાશરૂપેણાઙ્ગીકૃતવન્તઃ | 19 બહવો માયાકર્મકારિણઃ સ્વસ્વગ્રન્થાન્
 આનીય રાશીકૃત્ય સર્વેષાં સમક્ષમ્ અદાહયન્, તતો ગણાનાં કૃત્વાબુધ્યન્ત
 પત્રાચુતરૂપ્યમુદ્રામૂલ્યપુસ્તકાનિ દગ્ધાનિ | 20 ઇત્યં પ્રભોઃ કથા સર્વદેશં
 વ્યાપ્ય પ્રબલા જાતા | 21 સર્વેષ્વેતેષુ કર્મસુ સમ્પન્નેષુ સત્સુ પૌલો
 માકિદનિયાખ્યાદેશાભ્યાં ચિરૂશાલમં ગન્તું મતિં કૃત્વા કથિતવાન્ તત્સ્થાનં
 યાત્રાયાં કૃતાયાં સત્યાં મયા રોમાનગરં દ્રષ્ટવ્યં | 22 સ્વાનુગતલોકાનાં
 તીમથિયેરાસ્તૌ દ્વૌ જનૌ માકિદનિયાદેશં પ્રતિ પ્રહિત્ય સ્વયમ્ આશિયાદેશે
 કતિપચદિનાનિ સ્થિતવાન્ | 23 કિન્તુ તસ્મિન્ સમયે મતેડસ્મિન્ કલહો
 જાતઃ | 24 તત્કારણમિદં, અર્તિમીદેવ્યા રૂપ્યમન્દિરનિર્માણેન સર્વેષાં
 શિલ્પિનાં યથેષ્ટલાભમ્ અજનયત્ યો દીમીત્રિયનામા નાડીન્ધમઃ 25
 સ તાન્ તત્કર્મજીવિનઃ સર્વલોકાંશ્ચ સમાહૂય ભાષિતવાન્ હે મહેચ્છા

એતેન મન્દિરનિર્માણેનાસ્માકં જીવિકા ભવતિ, એતદ્ યૂયં વિત્થ; 26
 કિન્તુ હસ્તનિર્મિતેશ્વરા ઇશ્વરા નહિ પૌલનામ્ના કેનચિજ્જનેન કથામિમાં
 વ્યાહત્ય કેવલેદ્દિષનગરે નહિ પ્રાયેણ સર્વસ્મિન્ આશિયાદેશે પ્રવૃત્તિ
 ગ્રાહયિત્વા બહુલોકાનાં શેમુષી પરાવર્તિતા, એતદ્ યુષ્માભિ દૃશ્યતે શ્રૂયતે
 ચ | 27 તેનાસ્માકં વાણિજ્યસ્ય સર્વથા હાને: સમ્ભવનં કેવલમિતિ નહિ,
 આશિયાદેશસ્થૈ વાં સર્વજગત્સ્થૈ લોકૈ: પૂજ્યા ચાર્તિમી મહાદેવી તસ્યા
 મન્દિરસ્યાવજ્ઞાનસ્ય તસ્યા ઐશ્વર્યસ્ય નાશસ્ય ચ સમ્ભાવના વિધતે |
 28 એતાદૃશીં કથાં શ્રુત્વા તે મહાક્રોધાન્વિતા: સન્ત ઉચ્ચૈ:કારં કથિતવન્ત
 ઇદ્દિષીયાનામ્ અર્તિમી દેવી મહતી ભવતિ | 29 તત: સર્વનગરં કલહેન
 પરિપૂર્ણમભવત્, તત: પરં તે માકિદનીયગાયારિસ્તાર્પનામાનો પૌલસ્ય
 દ્વૌ સહચરૌ ધૃત્વૈકચિત્તા રજ્જભૂમિં જવેન ધાવિતવન્ત: | 30 તત: પૌલો
 લોકાનાં સન્નિધિં ચાતુમ્ ઉદ્યતવાન્ કિન્તુ શિષ્યગણસ્તં વારિતવાન્ |
 31 પૌલસ્યત્મીયા આશિયાદેશસ્થા: કતિપયા: પ્રધાનલોકાસ્તસ્ય સમીપં
 નરમેકં પ્રેષ્ય ત્વં રજ્જભૂમિં માગા ઇતિ ન્યવેદ્યન્ | 32 તતો નાનાલોકાનાં
 નાનાકથાકથનાત્ સભા વ્યાકુલા જાતા કિં કારણાદ્ એતાવતી જનતાભવત્
 એતદ્ અધિકૈ લોકૈર્નાજ્ઞાયિ | 33 તત: પરં જનતામધ્યાદ્ ચિહ્નૈયૈર્બહિષ્કૃત:
 સિકન્દરો હસ્તેન સક્રેતં કૃત્વા લોકેભ્ય ઉત્તરં દાતુમુદ્યતવાન્, 34 કિન્તુ સ
 ચિહ્નૈયલોક ઇતિ નિશ્ચિતે સતિ ઇદ્દિષીયાનામ્ અર્તિમી દેવી મહતીતિ
 વાક્યં પ્રાયેણ પઞ્ચ દણ્ડાન્ યાવદ્ એકસ્વરેણ લોકનિવહૈ: પ્રોક્તં | 35
 તતો નગરાધિપતિસ્તાન્ સ્થિરાન્ કૃત્વા કથિતવાન્ હે ઇદ્દિષાયા: સર્વે
 લોકા આકર્ણયત, અર્તિમીમહાદેવ્યા મહાદેવાત્ પતિતાયાસ્તત્પ્રતિમાયાશ્ચ
 પૂજનમ ઇદ્દિષનગરસ્થા: સર્વે લોકા: કુર્વન્તિ, એતત્ કે ન જાનન્તિ? 36
 તસ્માદ્ એતત્પ્રતિકૂલં કેપિ કથયિતું ન શક્નુવન્તિ, ઇતિ જ્ઞાત્વા યુષ્માભિ:
 સુસ્થિરત્વેન સ્થાતવ્યમ્ અવિવિચ્ય કિમપિ કર્મ ન કર્તવ્યઞ્ચ | 37 યાન્
 એતાન્ મનુષ્યાન્ યૂયમત્ર સમાનયત તે મન્દિરદ્રવ્યાપહારકા યુષ્માકં દેવ્યા
 નિન્દકાશ્ચ ન ભવન્તિ | 38 યદિ કઞ્ચન પ્રતિ દીમીત્રિયસ્ય તસ્ય સહાયનાઞ્ચ
 કાયિદ્ આપત્તિ વિધતે તર્હિ પ્રતિનિધિલોકા વિચારસ્થાનઞ્ચ સન્તિ, તે
 તત્ સ્થાનં ગત્વા ઉત્તરપ્રત્યુત્તરે કુર્વન્તુ | 39 કિન્તુ યુષ્માકં કાયિદ્પરા
 કથા યદિ તિષ્ઠતિ તર્હિ નિયમિતાયાં સભાયાં તસ્યા નિષ્પત્તિ ભવિષ્યતિ |

40 કિન્વેતસ્ય વિરોધસ્યોત્તરં યેન દાતું શક્નુમ્ એતાદૃશસ્ય કસ્યચિત્ કારણસ્યાભાવાદ્ અધતનઘટનાહેતો રાજદ્રોહિણામિવાસ્માકમ્ અભિયોગો ભવિષ્યતીતિ શઙ્કા વિધતે | 41 ઇતિ કથયિત્વા સ સભાસ્થલોકાન્ વિસૃષ્ટવાન્ |

20 ઇત્યં કલહે નિવૃત્તે સતિ પૌલઃ શિષ્યગણમ્ આહૂય વિસર્જનં પ્રાપ્ય માકિદનિયાદેશં પ્રસ્થિતવાન્ | 2 તેન સ્થાનેન ગચ્છન્ તદેશીયાન્ શિષ્યાન્ બહૂપદિશ્ય યૂનાનીયદેશમ્ ઉપસ્થિતવાન્ | 3 તત્ર માસત્રયં સ્થિત્વા તસ્માત્ સુરિયાદેશં યાતુમ્ ઉધતઃ, કિન્તુ ચિહ્નૈયાસ્તં હન્તું ગુપ્તા અતિષ્ઠન્ તસ્માત્ સ પુનરપિ માકિદનિયામાર્ગેણ પ્રત્યાગન્તું મતિં કૃતવાન્ | 4 બિરયાનગરીયસોપાત્રઃ થિષલનીકીયારિસ્તાર્ખસિકુન્દૈ દબ્બાનગરીયગાયતીમથિયૌ આશિયાદેશીયતુખિકત્રિક્ષિમૌ ચ તેન સાર્દ્ધ આશિયાદેશં યાવદ્ ગતવન્તઃ | 5 એતે સર્વે ડગ્રસરાઃ સન્તો ડસ્માન્ અપેક્ષ્ય ત્રોયાનગરે સ્થિતવન્તઃ | 6 કિણ્વશૂન્યપૂપોત્સવદિને ચ ગતે સતિ વયં ક્ષિલિપીનગરાત્ તોયપથેન ગત્વા પઞ્ચભિ દિનેસ્ત્રોયાનગરમ્ ઉપસ્થાય તત્ર સપ્તાહસ્ય પ્રથમદિને પૂપાન્ ભંક્તુ શિષ્યેષુ મિલિતેષુ પૌલઃ પરદિને તસ્માત્ પ્રસ્થાતુમ્ ઉધતઃ સન્ તદહ્નિ પ્રાયેણ ક્ષપાયા યામદ્વયં યાવત્ શિષ્યેભ્યો ધર્મકથામ્ અકથયત્ | 8 ઉપરિસ્થે યસ્મિન્ પ્રકોષ્ઠે સભાં કૃત્વાસન્ તત્ર બહવઃ પ્રદીપાઃ પ્રાજ્વલન્ | 9 ઉતુખનામા કશ્ચન યુવા ચ વાતાયન ઉપવિશન્ ઘોરતરનિદ્રાગ્રસ્તો ડભૂત્ તદા પૌલેન બહુક્ષણં કથાયાં પ્રચારિતાયાં નિદ્રામગ્નઃ સ તસ્માદ્ ઉપરિસ્થતૃતીયપ્રકોષ્ઠાદ્ અપતત્, તતો લોકાસ્તં મૃતકલ્પં ધૃત્વોદતોલયન્ | 10 તતઃ પૌલોડવરુહ્ય તસ્ય ગાત્રે પતિત્વા તં કોડે નિધાય કથિતવાન્, યૂયં વ્યાકુલા મા ભૂત નાયં પ્રાણૈ વિચુક્તઃ | 11 પશ્ચાત્ સ પુનશ્ચોપરિ ગત્વા પૂપાન્ ભંક્ત્વા પ્રભાતં યાવત્ કથોપકથને કૃત્વા પ્રસ્થિતવાન્ | 12 તે ચ તં જીવન્તં યુવાનં ગૃહીત્વા ગત્વા પરમાખ્યાયિતા જાતાઃ | 13 અનન્તરં વયં પોતેનાગ્રસરા ભૂત્વાસ્મનગરમ્ ઉત્તીર્ય પૌલં ગ્રહીતું મતિમ્ અકુર્મ્મ યતઃ સ તત્ર પદ્ભ્યાં વ્રજિતું મતિં કૃત્વેતિ નિરૂપિતવાન્ | 14 તસ્માત્ તત્રાસ્માભિઃ સાર્દ્ધ તસ્મિન્ મિલિતે સતિ વયં તં નીત્વા મિતુલીન્યુપદ્વીપં પ્રાપ્તવન્તઃ | 15 તસ્માત્ પોતં મોચયિત્વા પરેડહનિ ખીયોપદ્વીપસ્ય સમ્મુખં લબ્ધવન્તસ્તસ્માદ્

એકેનાહા સામોપદ્વીપં ગત્વા પોતં લાગયિત્વા ત્રોગુલ્લિયે સ્થિત્વા પરસ્મિન્
 દિવસે મિલીતનગરમ્ ઉપાતિષ્ઠામ | 16 યતઃ પૌલ આશિયાદેશે કાલં
 યાપયિતુમ્ નામિલષન્ ઇક્ષિષનગરં ત્યક્ત્વા યાતું મન્ત્રણાં સ્થિરીકૃતવાન્;
 યસ્માદ્ યદિ સાધ્યં ભવતિ તર્હિ નિસ્તારોત્સવસ્ય પત્રાશત્તમદિને સ
 યિરૂશાલમ્યુપસ્થાતું મતિં કૃતવાન્ | 17 પૌલો મિલીતાદ્ ઇક્ષિષં પ્રતિ
 લોકં પ્રહિત્ય સમાજસ્ય પ્રાચીનાન્ આહૂયાનીતવાન્ | 18 તેષુ તસ્ય
 સમીપમ્ ઉપસ્થિતેષુ સ તેભ્ય ઇમાં કથાં કથિતવાન્ અહમ્ આશિયાદેશે
 પ્રથમાગમનમ્ આરભ્યાધ યાવદ્ યુષ્માકં સન્નિઘૌ સ્થિત્વા સર્વ્વસમયે
 યથાયરિતવાન્ તદ્ યૂયં જાનીથ; 19 ફલતઃ સર્વ્વથા નમ્રમનાઃ સન્ બહુશ્રુપાતેન
 યિહુદીયાનામ્ કુમન્ત્રણાજાતનાનાપરીક્ષાભિઃ પ્રભોઃ સેવામકરવં | 20 કામપિ
 હિતકથાં ન ગોપાયિતવાન્ તાં પ્રચાર્ચ્યં સપ્રકાશં ગૃહે ગૃહે સમુપદિશ્યેશ્વરં
 પ્રતિ મનઃ પરાવર્તનીયં પ્રભૌ યીશુષ્પ્રીષ્ટે વિશ્વસનીયં 21 યિહુદીયાનામ્
 અન્યદેશીયલોકાનાઞ્ચ સમીપ એતાદૃશં સાક્ષ્યં દદામિ | 22 પશ્યત સામ્પ્રતમ્
 આત્મનાકૃષ્ટઃ સન્ યિરૂશાલમ્નગરે યાત્રાં કરોમિ, તત્ર મામ્પ્રતિ યદ્ ઘટિષ્યતે
 તાન્યહં ન જાનામિ; 23 કિન્તુ મયા બન્ધનં કલેશઞ્ચ ભોક્તવ્ય ઇતિ પવિત્ર
 આત્મા નગરે નગરે પ્રમાણં દદાતિ | 24 તથાપિ તં કલેશમહં તૃણાય ન
 મન્યે; ઇશ્વરસ્યાનુગ્રહવિષયકસ્ય સુસંવાદસ્ય પ્રમાણં દાતું, પ્રભો યીશોઃ
 સકાશાદ યસ્યાઃ સેવાયાઃ ભારં પ્રાપ્નવં તાં સેવાં સાધયિતું સાનન્દં સ્વમાર્ગં
 સમાપયિતુઞ્ચ નિજપ્રાણાનપિ પ્રિયાન્ ન મન્યે | 25 અધુના પશ્યત યેષાં
 સમીપેડહમ્ ઇશ્વરીયરાજ્યસ્ય સુસંવાદં પ્રચાર્ચ્યં ભ્રમણં કૃતવાન્ એતાદૃશા
 યૂયં મમ વદનં પુન ડ્રૃષ્ટું ન પ્રાપ્સ્યથ એતદપ્યહં જાનામિ | 26 યુષ્મભ્યમ્
 અહમ્ ઇશ્વરસ્ય સર્વાન્ આદેશાન્ પ્રકાશયિતું ન ન્યવર્તે | 27 અહં સર્વ્વેષાં
 લોકાનાં રક્તપાતદોષાદ્ યન્નિર્દોષ આસે તસ્યાધ યુષ્માન્ સાક્ષિણઃ કરોમિ |
 28 યૂયં સ્વેષુ તથા યસ્ય વ્રજસ્યાધ્યક્ષન્ આત્મા યુષ્માન્ વિધાય ન્યયુડ્કત
 તત્સર્વ્વસ્મિન્ સાવધાના ભવત, ય સમાજઞ્ચ પ્રભુ નિજરક્તમૂલ્યેન ક્રીતવાન
 તમ્ અવત, 29 યતો મયા ગમને કૃતએવ દુર્જયા વૃકા યુષ્માકં મધ્યં પ્રવિશ્ય
 વ્રજં પ્રતિ નિર્દયતામ્ આચરિષ્યન્તિ, 30 યુષ્માકમેવ મધ્યાદપિ લોકા ઉત્થાય
 શિષ્યગણમ્ અપહન્તું વિપરીતમ્ ઉપદેક્ષ્યન્તીત્યહં જાનામિ | 31 ઇતિ
 હેતો યૂયં સચૈતન્યાઃ સન્તસ્તિષ્ઠત, અહઞ્ચ સાશ્રુપાતઃ સન્ વત્સરત્રયં યાવદ્

दिवानिंशं प्रतिजनं बोधयितुं न न्यवर्त्ते तदपि स्मरत | 32 षडानीं ले ब्रातरो
युष्माकं निष्ठां जनयितुं पवित्रीकृतलोकानां मध्येऽधिकारञ्च दातुं समर्थो य
ऽश्वरस्तस्यानुग्रहस्य यो वादश्च तयोरुत्तमयो युष्मान् समार्पयम् | 33
कस्यापि स्वार्णं रूथं वस्त्रं वा प्रति मया लोभो न कृतः | 34 किन्तु मम
मत्सहयलोकानाञ्चावश्यकव्ययाय मदीयमिदं करद्वयम् अश्राभ्यद् अतद्
यूयं जानीथ | 35 अनेन प्रकारेण ग्रहणद् दानं भद्रमिति यद्वाक्यं प्रभु र्थीशुः
कथितवान् तत् स्मर्त्तुं दरिद्रलोकानामुपकारार्थं श्रमं कर्त्तुञ्च युष्माकम् उचितम्
अतस्सर्व्वं युष्मानहम् उपदिष्टवान् | 36 अंतां कथां कथयित्वा स जनुनी
पातयित्वा सर्व्वैः सह प्रार्थयत | 37 तेन ते कन्दन्तः 38 पुन र्भम मुष्मं न
द्रक्षथ विशेषत अेषा या कथा तेनाकथि तत्कारणात् शोकं विलापञ्च कृत्वा
कण्ठं धृत्वा युष्मितवन्तः | पश्चात् ते तं पोतं नीतवन्तः |

21 तै र्विसृष्टाः सन्तो वयं पोतं बाहयित्वा ऋजुमार्गोण कोषम्
उपद्वीपम् आगत्य परेऽहनि रोदियोपद्वीपम् आगच्छाम ततस्तस्मात्
पातारयाम् उपातिष्ठाम | 2 तत्र कैनीकियादेशगामिनम् पोतमेकं प्राप्य
तमारुह्य गतवन्तः | 3 कुप्रोपद्वीपं दृष्ट्वा तं सव्यदिशि स्थापयित्वा
सुरियादेशं गत्वा पोतस्थद्रव्याण्यवरोहयितुं सोरनगरे लागितवन्तः |
4 तत्र शिष्यगणस्य साक्षात्करणाय वयं तत्र सप्तदिनानि स्थितवन्तः
पश्चात्ते पवित्रोपात्मना पौलं व्याहरन् त्वं यिज्ञुशालभनगरं मा गमः | 5
ततस्तेषु सप्तसु दिनेषु यापितेषु सत्सु वयं तस्मात् स्थानात् निजवर्त्मना
गतवन्तः, तस्मात् ते सवालवृद्धवनिता अस्माभिः सह नगरस्य
परिसरपर्यन्तम् आगताः पश्चाद्द्वयं जलधितटे जनुपातं प्रार्थयामहि |
6 ततः परस्परं विसृष्टाः सन्तो वयं पोतं गतास्ते तु स्वस्वगृहं
प्रत्यागतवन्तः | 7 वयं सोरनगरात् नावा प्रस्थाय तलिमायिनगरम्
उपातिष्ठाम तत्रास्माकं समुद्रीयमार्गस्यान्तोऽभवत् तत्र ब्रातृगणं नमस्कृत्य
दिनमेकं तैः सार्द्धम् उषतवन्तः | 8 परे ऽहनि पौलस्तस्य सङ्गिनो वयञ्च
प्रतिष्ठमानाः कैसरियानगरम् आगत्य सुसंवाद्यप्रचारकानां सप्तजनानां
ङ्गिलिपनाम्न अेकस्य गृहं प्रविश्यावतिष्ठाम | 9 तस्य यतस्त्रो दृष्टितरोऽनूढा
भविष्यद्वादिन्य आसन् | 10 तत्रास्मासु बहुदिनानि प्रोषितेषु यिद्धीयदेशाद्
आगत्यागाभनामा भविष्यद्वादी समुपस्थितवान् | 11 सोस्माकं समीपमेत्य

પૌલસ્ય કટિબન્ધનં ગૃહીત્વા નિજહસ્તાપાદાન્ બદ્ધ્વા ભાષિતવાન્ યસ્યેદં
 કટિબન્ધનં તં ચિહ્નુદીયલોકા ચિરુશાલમનગર ઇત્યં બદ્ધ્વા ભિન્નદેશીયાનાં
 કરેષુ સમર્પયિષ્યન્તીતિ વાક્યં પવિત્ર આત્મા કથયતિ | 12 એતાદૃશીં
 કથાં શ્રુત્વા વયં તન્નગરવાસિનો ભ્રાતરશ્ચ ચિરુશાલમં ન યાતું પૌલં
 વ્યનયામહિ; 13 કિન્તુ સ પ્રત્યાવાદીત્, યૂયં કિં કુરુથ? કિં ક્રન્દનેન
 મમાન્તઃકરણં વિદીર્ણં કરિષ્યથ? પ્રભો રીંશો નામ્નો નિમિત્તં ચિરુશાલમિ
 બદ્ધો ભવિતું કેવલ તન્ન પ્રાણાન્ દાતુમપિ સસજ્જોસ્મિ | 14 તેનાસ્માકં
 કથાયામ્ અગૃહીતાયામ્ ઈશ્વરસ્ય યથેચ્છા તથૈવ ભવત્વિત્યુક્ત્વા વયં
 નિરસ્યામ | 15 પરેડહનિ પાથેયદ્રવ્યાણિ ગૃહીત્વા ચિરુશાલમં પ્રતિ
 યાત્રામ્ અકુર્મ | 16 તતઃ કૈસરિયાનગરનિવાસિનઃ કતિપયાઃ શિષ્યા
 અસ્માભિઃ સાર્દ્ધમ્ ઇત્વા કૃપ્રીયેન મ્નાસન્નામ્ના યેન પ્રાચીનશિષ્યેન સાર્દ્ધમ્
 અસ્માભિ વસ્તવ્યં તસ્ય સમીપમ્ અસ્માન્ નીતવન્તઃ | 17 અસ્માસુ
 ચિરુશાલમ્યુપસ્થિતેષુ તત્રસ્થભ્રાતૃગણોડસ્માન્ આહ્વાદેન ગૃહીતવાન્ |
 18 પરસ્મિન્ દિવસે પૌલેડસ્માભિઃ સહ યાકૂબો ગૃહં પ્રવિષ્ટે લોકપ્રાચીનાઃ
 સર્વે તત્ર પરિષદિ સંસ્થિતાઃ | 19 અનન્તરં સ તાન્ નત્વા સ્વીયપ્રચારણેન
 ભિન્નદેશીયાન્ પ્રતીશ્વરો યાનિ કર્માણિ સાધિતવાન્ તદીયાં કથામ્
 અનુક્રમાત્ કથિતવાન્ | 20 ઇતિ શ્રુત્વા તે પ્રભું ધન્યં પ્રોચ્ય વાક્યમિદમ્
 અભાષન્ત, હે ભ્રાત રિહ્નુદીયાનાં મધ્યે બહુસહસ્રાણિ લોકા વિશ્વાસિન
 આસતે કિન્તુ તે સર્વે વ્યવસ્થામતાચારિણ એતત્ પ્રત્યક્ષં પશ્યસિ |
 21 શિશૂનાં ત્વક્ષેદનાધાયરણં પ્રતિષિધ્ય ત્વં ભિન્નદેશનિવાસિનો
 ચિહ્નુદીયલોકાન્ મૂસાવાક્યમ્ અશ્રદ્ધાતુમ્ ઉપદિશસીતિ તૈઃ શ્રુતમસ્તિ | 22
 ત્વમત્રાગતોસીતિ વાર્તાં સમાકર્ણ્ય જનનિવહો મિલિત્વાવશ્યમેવાગમિષ્યતિ;
 અતએવ કિં કરણીયમ્? અત્ર વયં મન્ત્રયિત્વા સમુપાયં ત્વાં વદામસ્તં
 ત્વમાચર | 23 વ્રતં કર્તુ કૃતસહુલ્યા યેડસ્માકં યત્વારો માનવાઃ સન્તિ
 24 તાન્ ગૃહીત્વા તૈઃ સહિતઃ સ્વં શુચિં કુરુ તથા તેષાં શિરોમુણ્ડને
 યો વ્યયો ભવતિ તં ત્વં દેહિ | તથા કૃતે ત્વદીયાચારે યા જનશ્રુતિ
 જ્ઞાયતે સાલીકા કિન્તુ ત્વં વિધિં પાલયન્ વ્યવસ્થાનુસારેણેવાચરસીતિ તે
 ભોત્સન્તે | 25 ભિન્નદેશીયાનાં વિશ્વાસિલોકાનાં નિકટે વયં પત્રં લિખિત્વેત્યં
 સ્થિરીકૃતવન્તઃ, દેવપ્રસાદભોજનં રક્તં ગલપીડનમારિતપ્રાણિભોજનં

વ્યભિચારશ્ચૈતેભ્યઃ સ્વરક્ષણવ્યતિરેકેણ તેષામન્યવિધિપાલનં કરણીયં ન |
 26 તતઃ પૌલસ્તાન્ માનુષાનાદાય પરસ્મિન્ દિવસે તૈઃ સહ શુચિ ભૂત્વા
 મન્દિરં ગત્વા શૌચકર્માણો દિનેષુ સમ્પૂર્ણેષુ તેષામ્ એકૈકાર્થં નૈવેદ્યાધુત્સર્ગો
 ભવિષ્યતીતિ જ્ઞાપિતવાન્ | 27 તેષુ સપ્તસુ દિનેષુ સમાપ્તકલ્પેષુ
 આશિયાદેશનિવાસિનો યિહૂદીયાસ્તં મધ્યેમન્દિરં વિલોક્ય જનનિવહસ્ય
 મનઃસુ કુપ્રવૃત્તિં જનયિત્વા તં ધૃત્વા 28 પ્રોચ્યૈઃ પ્રાવોચન્ હે ઇસ્રાયેલ્લોકાઃ
 સર્વે સાહાય્યં કુરુત | યો મનુજ એતેષાં લોકાનાં મૂસાવ્યવસ્થાયા એતસ્ય
 સ્થાનસ્યાપિ વિપરીતં સર્વત્ર સર્વાન્ શિક્ષયતિ સ એષઃ; વિશેષતઃ સ
 ભિન્દેશીયલોકાન્ મન્દિરમ્ આનીય પવિત્રસ્થાનમેતદ્ અપવિત્રમકરોત્ | 29
 પૂર્વં તે મધ્યેનગરમ્ ઇક્ષિષનગરીયં ત્રિક્ષિમં પૌલેન સહિતં દૃષ્ટવન્ત એતસ્માત્
 પૌલસ્તં મન્દિરમધ્યમ્ આનયદ્ ઇત્યન્વમિમત | 30 અતએવ સર્વસ્મિન્
 નગરે કલહોત્પન્નત્વાત્ ધાવન્તો લોકા આગત્ય પૌલં ધૃત્વા મન્દિરસ્ય
 બહિરાકૃષ્ચ્યાનયન્ તત્ક્ષણાદ્ દ્વારાણિ સર્વાણિ ચ રુદ્ધાનિ | 31 તેષુ તં
 હન્તુમુધતેષુ યિરૂશાલમ્નગરે મહાનુપદ્રવો જાત ઇતિ વાર્તાયાં સહસ્રસેનાપતેઃ
 કર્ણગોચરીભૂતાયાં સત્યાં સ તત્ક્ષણાત્ સૈન્યાનિ સેનાપતિગણાન્ ગૃહીત્વા
 જવેનાગતવાન્ | 32 તતો લોકાઃ સેનાગણેન સહ સહસ્રસેનાપતિમ્
 આગચ્છન્તં દૃષ્ટ્વા પૌલતાડનાતો ન્યવર્તન્ત | 33 સ સહસ્રસેનાપતિઃ
 સન્નિધાવાગમ્ય પૌલં ધૃત્વા શૃંગ્બલદ્વયેન બદ્ધમ્ આદિશ્ય તાન્ પૃષ્ટવાન્
 એષ કઃ? કિં કર્મ યાયં કૃતવાન્? 34 તતો જનસમૂહસ્ય કશ્ચિદ્ એકપ્રકારં
 કશ્ચિદ્ અન્યપ્રકારં વાક્યમ્ અરૌત્ સ તત્ર સત્યં જ્ઞાતુમ્ કલહકારણાદ્
 અશક્તઃ સન્ તં દુર્ગં નેતુમ્ આજ્ઞાપયત્ | 35 તેષુ સોપાનસ્યોપરિ પ્રાપ્તેષુ
 લોકાનાં સાહસકારણાત્ સેનાગણઃ પૌલમુત્તોલ્ય નીતવાન્ | 36 તતઃ સર્વે
 લોકાઃ પશ્ચાદ્ગામિનઃ સન્ત એનં દુરીકુરુતેતિ વાક્યમ્ ઉચ્યૈરવદન્ | 37
 પૌલસ્ય દુર્ગાનયનસમયે સ તસ્મૈ સહસ્રસેનાપતયે કથિતવાન્, ભવતઃ
 પુરસ્તાત્ કથાં કથયિતું કિમ્ અનુમન્યતે? સ તમપૃચ્છત્ ત્વં કિં યૂનાનીયાં
 ભાષાં જાનાસિ? 38 યો મિસરીયો જનઃ પૂર્વં વિરોધં કૃત્વા ચત્વારિ
 સહસ્રાણિ ઘાતકાન્ સક્તિનઃ કૃત્વા વિપિનં ગતવાન્ ત્વં કિં સએવ ન ભવસિ?
 39 તદા પૌલોડકથયત્ અહં કિલિકિયાદેશસ્ય તાર્ષનગરીયો યિહૂદીયો, નાહં
 સામાન્યનગરીયો માનવઃ; અતએવ વિનયેડહં લોકાનાં સમક્ષં કથાં કથયિતું

मामनुजानीष्व | 40 तेनानुज्ञातः पौलः सोपानोपरि तिष्ठन् हस्तेनेङ्गितं
कृतवान्, तस्मात् सर्वे सुस्थिरा अभवन् | तदा पौल एव्रीयभाषया
कथयितुम् आरभत,

22 हे पितृगणा हे भ्रातृगणाः, एदानीं मम निवेदने समवधत् |
2 तदा स एव्रीयभाषया कथां कथयतीति श्रुत्वा सर्वे लोका
अतीव निःशब्दा सन्तोऽतिष्ठन् | 3 पश्चात् सोऽकथयद् अहं
यिहूदीय एति निश्चयः किलिकियादेशस्य तार्षनगरं मम जन्मभूमिः,
अतन्नगरीयस्य गमिलीयेलनाम्नोऽध्यापकस्य शिष्यो भूत्वा पूर्वपुरुषाणां
विधिव्यवस्थानुसारेण सम्पूर्णांशुपेण शिक्षितोऽभवम् एदानीन्तना यूयं
यादृशा भवथ तादृशोऽहमपीश्वरसेवायाम् उद्योगी जातः | 4 मतमेतद्
द्विष्ट्वा तद्ग्राहिनारीपुरुषान् कारायां बद्ध्वा तेषां प्राणनाशपर्यन्तां
विपक्षताम् अकरवम् | 5 मलायाजकः सत्वासदः प्राचीनलोकाश्च
ममैतस्याः कथायाः प्रमाणं दातुं शक्नुवन्ति, यस्मात् तेषां समीपाद्
एम्पेकनगरनिवासिभ्रातृगणार्थम् आज्ञापत्राणि गृहीत्वा ये तत्र
स्थितास्तान् एऽऽयितुं यिज्ञशलमम् आनयनार्थं एम्पेकनगरं गतोस्मि | 6
किन्तु गच्छन् तन्नगरस्य समीपं प्राप्तवान् तदा द्वितीयप्रहरवेलायां सत्याम्
अकस्माद् गगणान्निर्गत्य मलती दीप्ति र्भम यतुर्दिशि प्रकाशितवती |
7 ततो मयि भूमौ पतिते सति, हे शौल हे शौल कुतो मां ताऽयसि?
माभ्रति भाषित अतादृश अको रवोपि मया श्रुतः | 8 तदाहं प्रत्यवदं,
हे प्रभे को भवान्? ततः सोऽवादीत् यं त्वं ताऽयसि स नासरतीयो
यीशुरहं | 9 मम सङ्गिनो लोकास्तां दीप्तिं दृष्ट्वा त्रियं प्राप्ताः, किन्तु
माभ्रत्युदितं तद्वाक्यं ते नाबुध्यन्त | 10 ततः परं पृष्ठवानहं, हे प्रभो
मया किं कर्तव्यं? ततः प्रभुरकथयत्, उत्थाय एम्पेकनगरं याहि त्वया
यधत् कर्तव्यं निरूपितमास्ते तत् तत्र त्वं ज्ञापयिष्यसे | 11 अनन्तरं
तस्याः भरतरदीप्तेः कारणात् किमपि न दृष्ट्वा सङ्गिगणेन धृतहस्तः सन्
एम्पेकनगरं प्रजितवान् | 12 तन्नगरनिवासिनां सर्वेषां यिहूदीयानां
मान्यो व्यवस्थानुसारेण भक्तश्च हनानीयनामा मानव अको 13 मम
सन्निधिम् अेत्य तिष्ठन् अकथयत्, हे भ्रातः शौल सुदृष्टि र्भव तस्मिन्
एऽऽऽहं सम्भङ् तं दृष्टवान् | 14 ततः स मह्यं कथितवान् यथा त्वम्

ઈશ્વરસ્વાભિપ્રાયં વેત્સિ તસ્ય શુદ્ધસત્ત્વજનસ્ય દર્શનં પ્રાપ્ય તસ્ય શ્રીમુખસ્ય
 વાક્યં શૃણોષિ તન્નિમિત્તમ્ અસ્માકં પૂર્વપુરુષાણામ્ ઈશ્વરસ્ત્વાં મનોનીતં
 કૃતવાનં | 15 યતો યદદ્ અદ્રાક્ષીરશ્રીષીશ્ચ સર્વેષાં માનવાનાં સમીપે ત્વં
 તેષાં સાક્ષી ભવિષ્યસિ | 16 અતએવ કુતો વિલમ્બસે? પ્રભો નામ્ના પ્રાર્થ્ય
 નિજપાપપ્રક્ષાલનાર્થં મજ્જનાય સમુત્તિષ્ઠ | 17 તતઃ પરં યિરૂશાલમ્નગરં
 પ્રત્યાગત્ય મન્દિરેડહમ્ એકદા પ્રાર્થયે, તસ્મિન્ સમયેડહમ્ અભિભૂતઃ સન્
 પ્રભૂ સાક્ષાત્ પશ્યન્, 18 ત્વં ત્વરયા યિરૂશાલમઃ પ્રતિષ્ઠસ્વ યતો લોકામયિ
 તવ સાક્ષ્યં ન ગ્રહીષ્યન્તિ, મામ્પ્રત્યુદિતં તસ્યેદં વાક્યમ્ અશ્રીષમ્ | 19
 તતોહં પ્રત્યવાદિષમ્ હે પ્રભો પ્રતિભજનભવનં ત્વયિ વિશ્વાસિનો લોકાન્
 બદ્ધવા પ્રહતવાન્, 20 તથા તવ સાક્ષિણઃ સ્તિફાનસ્ય રક્તપાતનસમયે તસ્ય
 વિનાશં સમ્મન્ય સન્નિધૌ તિષ્ઠન્ હન્તૃલોકાનાં વાસાંસિ રક્ષિતવાન્, એતત્ તે
 વિદુઃ | 21 તતઃ સોડકથયત્ પ્રતિષ્ઠસ્વ ત્વાં દૂરસ્થભિન્નદેશીયાનાં સમીપં
 પ્રેષયિષ્યે | 22 તદા લોકા એતાવત્પર્યન્તાં તદીયાં કથાં શ્રુત્વા પ્રોચ્ચૈરકથયન્,
 એનં ભૂમણ્ડલાદ્ દૂરીકુરુત, એતાદૃશજનસ્ય જીવનં નોચિતમ્ | 23
 ઇત્યુચ્ચૈઃ કથયિત્વા વસનાનિ પરિત્યજ્ય ગગાણં પ્રતિ ધૂલીરક્ષિપન્ 24 તતઃ
 સહસ્રસેનાપતિઃ પૌલં દુર્ગાભ્યન્તર નેતું સમાદિશત્ | એતસ્ય પ્રતિકૂલાઃ
 સન્તો લોકાઃ કિન્નિમિત્તમ્ એતાવદુચ્ચૈઃસ્વરમ્ અકુર્વન્, એતદ્ વેતું તં કશયા
 પ્રહત્ય તસ્ય પરીક્ષાં કર્તુમાદિશત્ | 25 પદાતયશ્રમ્નિર્મિતરજ્જુભિસ્તસ્ય
 બન્ધનં કર્તુમુદતાસ્તાસ્તદાનીં પૌલઃ સમ્મુખસ્થિતં શતસેનાપતિમ્ ઉક્તવાન્
 દણ્ડાણાયામ્ અપ્રાપ્તાયાં કિં રોમિલોકં પ્રહર્તું યુષ્માકમ્ અધિકારોસ્તિ? 26
 એનાં કથાં શ્રુત્વા સ સહસ્રસેનાપતેઃ સન્નિધિં ગત્વા તાં વાર્તામવદત્ સ
 રોમિલોક એતસ્માત્ સાવધાનઃ સન્ કર્મ્ કુરુ | 27 તસ્માત્ સહસ્રસેનાપતિ
 ગત્વા તમપ્રાક્ષીત્ ત્વં કિં રોમિલોકઃ? ઇતિ માં બ્રૂહિ | સોડકથયત્ સત્યમ્ |
 28 તતઃ સહસ્રસેનાપતિઃ કથિતવાન્ બહુદ્રવિણં દત્વાહં તત્ પૌરસખ્યં
 પ્રાપ્તવાન્; કિન્તુ પૌલઃ કથિતવાન્ અહં જનુના તત્ પ્રાપ્તોડસ્મિ | 29 ઇત્યં
 સતિ યે પ્રહારેણ તં પરીક્ષિતું સમુદતા આસન્ તે તસ્ય સમીપાત્ પ્રાતિષ્ઠન્તઃ;
 સહસ્રસેનાપતિસ્તં રોમિલોકં વિજ્ઞાય સ્વયં યત્ તસ્ય બન્ધનમ્ અકાર્ષીત્
 તત્કારણાદ્ અભિભેત્ | 30 યિહૂદીયલોકાઃ પૌલં કુતોડપવદન્તે તસ્ય
 વૃતાન્તં જ્ઞાતું વાચ્છન્ સહસ્રસેનાપતિઃ પરેડહનિ પૌલં બન્ધનાત્ મોચયિત્વા

प्रधानयाजकान् मडासत्मायाः सर्व्वलोकान् समुपस्थातुम् आदिश्य तेषां
सन्निधौ पौलम् अवरोह्य स्थापितवान्।

23 सत्मासद्लोकान् प्रति पौलोऽनन्यदृष्ट्या पश्यन् अकथयत्, हे ब्रातृगाणा
अध यावत् सरलेन सर्व्वान्तःकरणेश्वरस्य साक्षाद् आचरामि। 2
अनेन हनानीयनामा मडायाजकस्तं कपोले यपेटेनाहन्तुं समीपस्थलोकान्
आदिष्टवान्। 3 तदा पौलस्तमवदत्, हे बहिष्परिष्कृत, एश्वरस्त्वां प्रहर्तुम्
उधतोस्ति, यतो व्यवस्थानुसारेण विचारयितुम् उपविश्य व्यवस्थां लङ्घित्वा
मां प्रहर्तुम् आज्ञापयसि। 4 ततो निकटस्था लोका अकथयन्, त्वं किम्
एश्वरस्य मडायाजकं निन्दसि? 5 ततः पौलः प्रतिभाषितवान् हे ब्रातृगाण
मडायाजक ओष एति न बुद्धं मया तदन्यथ स्वलोकानाम् अधिपतिं प्रति
दुर्वाक्यं मा कथय, अतादृशी लिपिरस्ति। 6 अनन्तरं पौलस्तेषाम् अर्द्धं
सिद्धूलोका अर्द्धं द्विर्लोकानां एति दृष्ट्वा प्रोच्यैः सत्मास्थलोकान् अवदत् हे
ब्रातृगाण अहं द्विर्लोकानाम् अधिपतिः सत्मानश्च, मृतलोकानाम्
उत्थाने प्रत्याशाकरणाद् अहमपवादितोस्मि। 7 एति कथायां कथितायां
द्विर्लोकानां परस्परं भिन्नवाक्यत्वात् सत्माया मध्ये द्वौ संघौ जातौ।
8 यतः सिद्धूलोका उत्थानं स्वर्गीयदूता आत्मानश्च सर्व्वेषाम् अतेषां
कमपि न मन्यन्ते, किन्तु द्विर्लोकानां सर्व्वम् अङ्गीकुर्वन्ति। 9 ततः परस्परम्
अतिशयकोलाहले समुपस्थिते द्विर्लोकानां पक्षीयाः सत्मास्था अध्यापकाः
प्रतिपक्षा उत्तिष्ठन्तोऽकथयन्, अतस्य मानवस्य कमपि दोषं न पश्यामः;
यदि कश्चिद् आत्मा वा कश्चिद् दूत अनेन प्रत्यादिशत् तर्हि वयम् एश्वरस्य
प्रातिकूल्येन न योत्स्यामः। 10 तस्माद् अतीव भिन्नवाक्यत्वे सति ते पौलं
भाण्डं भाण्डं करिष्यन्तीत्याशङ्क्या सत्ससेनापतिः सेनागाणं तत्स्थानं यातुं
सत्मातो बलात् पौलं धृत्वा दुर्गं नेतञ्चाज्ञापयत्। 11 रात्रौ प्रभुस्तस्य
समीपे तिष्ठन् कथितवान् हे पौल निर्भयो भव यथा यिज्ञालम्नगरे मयि
साक्ष्यं दत्तवान् तथा रोमानगरेपि त्वया दातव्यम्। 12 दिने समुपस्थिते
सति कियन्तो यिद्धूलोका अकथयन्तः सन्तः पौलं न हत्वा भोजनपाने
करिष्याम एति शपथेन स्वान् अबध्नन्। 13 यत्वारिंशज्जनेभ्योऽधिका
लोका एति पारम् अकुर्वन्। 14 ते मडायाजकानां प्राचीनलोकानाञ्च समीपं
गत्वा कथयन्, वयं पौलं न हत्वा किमपि न भोक्ष्यामहे दृढेनानेन शपथेन

બદ્ધવા અભવામ | 15 અતએવ સામ્પ્રતં સભાસદ્લોકેઃ સહ વયં તસ્મિન્
 કચ્છિદ્ વિશેષવિચારં કરિષ્યામસ્તદર્થં ભવાન્ શ્વો ડસ્માકં સમીપં તમ્
 આનયત્વિતિ સહસ્રસેનાપતયે નિવેદનં કુરુત તેન યુષ્માકં સમીપં ઉપસ્થિતેઃ
 પૂર્વં વયં તં હન્તુ સજ્જિજ્યામ | 16 તદા પૌલસ્ય ભાગિનેયસ્તેષામિતિ
 મન્ત્રણાં વિજ્ઞાય દુર્ગાં ગત્વા તાં વાર્તા પૌલમ્ ઉક્તવાન્ | 17 તસ્માત્
 પૌલ એકં શતસેનાપતિમ્ આહૂય વાક્યમિદમ્ ભાષિતવાન્ સહસ્રસેનાપતેઃ
 સમીપેડસ્ય યુવમનુષ્યસ્ય કિચ્છિન્નિવેદનમ્ આસ્તે, તસ્માત્ તત્સવિધમ્ એનં
 નય | 18 તતઃ સ તમાદાય સહસ્રસેનાપતેઃ સમીપમ્ ઉપસ્થાય કથિતવાન્,
 ભવતઃ સમીપેડસ્ય કિમપિ નિવેદનમાસ્તે તસ્માત્ બન્દિઃ પૌલો મામાહૂય
 ભવતઃ સમીપમ્ એનમ્ આનેતું પ્રાર્થિતવાન્ | 19 તદા સહસ્રસેનાપતિસ્તસ્ય
 હસ્તં ધૃત્વા નિર્જનસ્થાનં નીત્વા પૃષ્ટવાન્ તવ કિં નિવેદનં? તત્ કથય | 20
 તતઃ સોકથયત્, યિહૂદીયલાકાઃ પૌલે કમપિ વિશેષવિચારં છલં કૃત્વા તં સભાં
 નેતું ભવતઃ સમીપે નિવેદયિતું અમન્ત્રયન્ | 21 કિન્તુ ભવતા તન્ સ્વીકર્ત્વ્યં
 યતસ્તેષાં મધ્યેવર્તિનશ્રત્વારિંશજ્જનેભ્યો ડધિકલોકા એકમન્ત્રણા ભૂત્વા
 પૌલં ન હત્વા ભોજનં પાનઞ્ચ ન કરિષ્યામ ઇતિ શપથેન બદ્ધાઃ સન્તો ઘાતકા
 ઇવ સજ્જિજતા ઇદાનીં કેવલં ભવતો ડનુમતિમ્ અપેક્ષન્તે | 22 યામિમાં
 કથાં ત્વં નિવેદિતવાન્ તાં કર્મૈચિદપિ મા કથયેત્યુક્ત્વા સહસ્રસેનાપતિસ્તં
 યુવાનં વિસૃષ્ટવાન્ | 23 અનન્તરં સહસ્રસેનાપતિ દ્વૌ શતસેનાપતી
 આહૂયેદમ્ આદિશત્, યુવાં રાત્રૌ પ્રહરૈકાવશિષ્ટાયાં સત્યાં કૈસરિયાનગરં
 યાતું પદાતિસૈન્યાનાં દ્વે શતે ઘોટકારોહિસૈન્યાનાં સપ્તર્તિં શક્તિધારિસૈન્યાનાં
 દ્વે શતે ય જનાન્ સજ્જિજતાન્ કુરુતં | 24 પૌલમ્ આરોહયિતું ફીલિક્ષાધિપતેઃ
 સમીપં નિર્વિધનં નેતુઞ્ચ વાહનાનિ સમુપસ્થાપયતં | 25 અપરં સ પત્રં
 લિખિત્વા દત્તવાન્ તલ્લિખિતમેતત્, 26 મહામહિમશ્રીયુક્તફીલિક્ષાધિપતયે
 કલૌદિયલુષિયસ્ય નમસ્કારઃ | 27 યિહૂદીયલોકાઃ પૂર્વમ્ એનં માનવં ધૃત્વા
 સ્વહસ્તૈર્હન્તુમ્ ઉદ્યતા એતસ્મિન્નન્તરે સસૈન્યોહં તત્રોપસ્થાય એષ જનો
 રોમીય ઇતિ વિજ્ઞાય તં રક્ષિતવાન્ | 28 કિન્નિમિત્તં તે તમપવદન્તે તજ્ઞાતું
 તેષા સભાં તમાનાયિતવાન્ | 29 તતસ્તેષાં વ્યવસ્થાયા વિરુદ્ધયા કયાચન
 કથયા સોડપવાદિતોડભવત્, કિન્તુ સ શૂઙ્ખલબન્ધનાર્હો વા પ્રાણનાશાર્હો
 ભવતીદૃશઃ કોપ્યપરાધો મયાસ્ય ન દૃષ્ટઃ | 30 તથાપિ મનુષ્યસ્યાસ્ય વધાર્થં

यिडूदीया घातकाधव सञ्जिता अंतां वार्त्तां श्रुत्वा तत्क्षणात् तव समीपभेनं
 प्रेषितवान् अस्यापवादकांश्च तव समीपं गत्वापवदितुम् आज्ञापयम् |
 भवतः कुशलं भूयात् | 31 सैन्यगण आज्ञानुसारेण पौलं गृहीत्वा तस्यां
 रञ्ज्याम् आन्तिपात्रिनगरम् आनयत् | 32 परेऽहनि तेन सऽ यातुं
 घोटकाऽहसैन्यगणं स्थापयित्वा परावृत्य दुर्गं गतवान् | 33 ततः परे
 घोटकारोहिसैन्यगणः कैसरियानगरम् उपस्थाय तत्पत्रम् अधिपतेः करे
 समर्थं तस्य समीपे पौलम् उपस्थापितवान् | 34 तदाधिपतिस्तत्पत्रं
 पठित्वा पृष्ठवान् ओष किम्प्रदेशीयो जनः? स किलिकियाप्रदेशीय अको जन
 एति ज्ञात्वा कथितवान् 35 तवापवादकगण आगते तव कथां श्रोष्यामि |
 हेरोद्राजगृहे तं स्थापयितुम् आदिष्टवान् |

24 पञ्चम्यो दिनेभ्यः परं हनानीयनामा महायाजकोऽधिपतेः समक्षं
 पौलस्य प्रातिकूल्येन निवेदयितुं तर्तुल्लनामानं कञ्चन वक्तारं प्राचीनजनांश्च
 सङ्गिनः कृत्वा कैसरियानगरम् आगच्छत् | 2 ततः पौले समानीते सति
 तर्तुल्लस्तस्यापवादकथां कथयितुम् आरभत हे महामहिमङ्गीलिक्ष भवतो
 वयम् अतिनिर्व्विधं कालं यापयामो भवतः परिणामदर्शितया अेतद्देशीयानां
 बहूनि मङ्गलानि घटितानि, 3 एति हेतो र्वयमतिकृतज्ञाः सन्तः सर्वत्र
 सर्वदा भवतो गुणान् गायमः | 4 किन्तु बहुभिः कथाभिर्भवन्तं येन
 न विरञ्ज्यामि तस्माद् विनये भवान् अनुकम्प्य मदल्पकथां शृणोतु |
 5 ओष महामारीस्वऽपो नासरतीयमतग्राहिसंघातस्य मुष्यो भूत्वा
 सर्वदेशेषु सर्वेषां यिडूदीयानां राजद्रोहायरणप्रवृत्तिं जनयतीत्यस्माभि
 निश्चितं | 6 स मन्दिरमपि अशुचि कर्तुं येष्टितवान्; एति कारणाद्
 वयम् अंनं धृत्वा स्वव्यवस्थानुसारेण विचारयितुं प्रावर्त्तमिहि; 7 किन्तु
 लुषियः सऽस्रसेनापतिरागत्य बलाद् अस्माकं करेभ्य अंनं गृहीत्वा 8
 अेतस्यापवादकान् भवतः समीपम् आगन्तुम् आज्ञापयत् | वयं यस्मिन्
 तमपवादामो भवता पदपवादकथायां विचारितायां सत्यां सर्वं वृत्तान्तं
 वेदितुं शक्यते | 9 ततो यिडूदीया अपि स्वीकृत्य कथितवन्त ओषा
 कथा प्रमाणम् | 10 अधिपतौ कथां कथयितुं पौलं प्रतीङ्गितं कृतवति स
 कथितवान् भवान् बहून् वत्सरान् यावद् अेतद्देशस्य शासनं करोतीति
 विज्ञाय प्रत्युत्तरं दातुम् अक्षोभोऽभवम् | 11 अध केवलं द्वादश दिनानि

यातानि, अहम् आराधनां कर्तुं यिज्ञाशलमनगरं गतवान् अेषा कथा
 भवता ज्ञातुं शक्यते; 12 किन्त्विभे मां मध्येमन्दिरं केनापि सद वितर्षां
 कुर्वन्तं कुत्रापि भजनभवने नगरे वा लोकान् कुप्रवृत्तिं जनयन्तुं न
 दृष्टवन्तः। 13 एदानीं यस्मिन् यस्मिन् माम् अपवदन्ते तस्य किमपि
 प्रमाणां दातुं न शक्नुवन्ति। 14 किन्तु भविष्यद्वाक्यग्रन्थे व्यवस्थाग्रन्थे
 य या कथा लिखितास्ते तासु सर्व्वासु विश्वस्य यन्मतम् एमे विधर्म्म
 जानन्ति तन्मतानुसारेणाहं निजपितृपुरुषाणाम् एश्वरम् आराधयामीत्यहं
 भवतः समक्षम् अङ्गीकरोमि। 15 धार्म्मिकाणाम् अधार्म्मिकाणाञ्च
 प्रभीतलोकानामेवोत्थानं भविष्यतीति कथामिमे स्वीकुर्वन्ति तथाहमपि
 तस्मिन् एश्वरे प्रत्याशां करोमि; 16 एश्वरस्य मानवानाञ्च समीपे यथा
 निर्दोषो भवामि तदर्थं सततं यत्नवान् अस्मि। 17 बहुषु वत्सरेषु गतेषु
 स्वदेशीयलोकानां निमित्तं दानीयद्रव्याणि नैवेदानि य समादाय पुनरागमनं
 कृतवान्। 18 ततोहं शुचिर्भूत्वा लोकानां समागमं कलहं वा न कारितवान्
 तथाप्याशियादेशीयाः कियन्तो यिहुदीयलोका मध्येमन्दिरं मां धृतवन्तः। 19
 ममोपरि यद्वि कायिदपवाहकथास्ति तर्हि भवतः समीपम् उपस्थाय तेषामेव
 साक्ष्यदानम् उचितम्। 20 नोयेत् पूर्व्वं मडासभास्थानां लोकानां सन्निधौ
 मम दण्डायमानत्वसमये, अहमध मृतानामुत्थाने युष्माभि विचारितोस्मि,
 21 तेषां मध्ये तिष्ठन्नहं यामिमां कथामुच्यैः स्वरेण कथितवान् तदन्यो
 मम कोपि दोषोऽलभ्यत न वेति वरम् अते समुपस्थितलोका वदन्तु। 22
 तदा ह्रीलिक्ष अतां कथां श्रुत्वा तन्मतस्य विशेषवृत्तान्तं विज्ञातुं विचारं
 स्थगितं कृत्वा कथितवान् लुषिये सदस्रसेनापतौ समायाते सति युष्माकं
 विचारम् अहं निष्पादयिष्यामि। 23 अनन्तरं बन्धनं विना पौलं रक्षितुं
 तस्य सेवनाय साक्षात्कराय वा तदीयात्मीयबन्धुजनान् न वारयितुञ्च
 शमसेनापतिम् आदिष्टवान्। 24 अल्पदिनात् परं ह्रीलिक्षोऽधिपति
 र्दुषिल्लानाम्ना यिहुदीयया स्वभार्य्या सडागत्य पौलमाहूय तस्य मुष्मात्
 श्रीष्टधर्म्मस्य वृत्तान्तम् अश्रौषीत्। 25 पौलेन न्यायस्य परिमितभोगस्य
 यरमविचारस्य य कथायां कथितायां सत्यां ह्रीलिक्षः कम्पमानः सन् व्याहर्द्द
 एदानीं याहि, अहम् अवकाशं प्राप्य त्वाम् आहूस्यामि। 26 मुक्तिप्रप्त्यर्थं
 पौलेन मह्यं मुद्रादास्यन्ते एति पत्याशां कृत्वा स पुनः पुनस्तमाहूय तेन साकं

कथोपकथनं कृतवान्। 27 किन्तु वत्सरद्वयात् परं पर्कियङ्गीष्ट झालिक्षस्य पदं प्राप्ते सति झीलिक्षो यिडूटीयान् सन्तुष्टान् यिडीर्षन् पौलं बद्धं संस्थाप्य गतवान्।

25 अनन्तरं झीष्टो निजराज्यम् आगत्य दिनत्रयात् परं कैसरियातो यिडूशालमनगरम् आगमत्। 2 तदा मलायाजको यिडूटीयानां प्रधानलोकाश्च तस्य समक्षं पौलम् अपावदन्त। 3 भवान् तं यिडूशालमम् आनेतुम् आज्ञापयत्विति विनीय ते तस्माद् अनुग्रहं वाञ्छितवन्तः। 4 यतः पश्चिमध्ये गोपनेन पौलं हन्तुं तैर्घातका नियुक्ताः। झीष्ट उत्तरं दत्तवान् पौलः कैसरियायां स्थास्यति पुनरल्पदिनात् परम् अहं तत्र यास्यामि। 5 ततस्तस्य मानुषस्य यद्वि कश्चिद् अपराधस्तिष्ठति तर्हि युष्माकं ये शक्नुवन्ति ते मया सह तत्र गत्वा तमपवदन्तु स अंतां कथां कथितवान्। 6 दशदिवसेभ्योऽधिकं विलम्ब्य झीष्टस्तस्मात् कैसरियानगरं गत्वा परस्मिन् दिवसे विचारसन उपदिश्य पौलम् आनेतुम् आज्ञापयत्। 7 पौले समुपस्थिते सति यिडूशालमनगराद् आगता यिडूटीयलोकास्तं यतुर्दिशि संवेष्ट्य तस्य विरुद्धं बद्धून् मलायोषान् उत्थापितवन्तः किन्तु तेषां किमपि प्रमाणं दातुं न शक्नुवन्तः। 8 ततः पौलः स्वस्मिन् उत्तरमिदम् उदितवान्, यिडूटीयानां व्यवस्थाया मन्दिरस्य कैसरस्य वा प्रतिकूलं किमपि कर्म नाहं कृतवान्। 9 किन्तु झीष्टो यिडूटीयान् सन्तुष्टान् कर्तुम् अभिलषन् पौलम् अभाषत त्वं किं यिडूशालमं गत्वास्मिन् अभियोगे मम साक्षाद् विचारितो भविष्यसि? 10 ततः पौल उत्तरं प्रोक्तवान्, यत्र मम विचारो भवितुं योग्यः कैसरस्य तत्र विचारसन अत्र समुपस्थितोस्मि; अहं यिडूटीयानां कामपि हानिं नाकार्षम् इति भवान् यथार्थतो विजानाति। 11 कञ्चिदपराधं किञ्चन वधार्हं कर्म वा यद्यहम् अकरिष्यं तर्हि प्राणहाननदण्डमपि भोक्तुम् उद्यतोऽभविष्यं, किन्तु ते मम समपवादं कुर्वन्ति स यद्वि कल्पितमात्रो भवति तर्हि तेषां करेषु मां समर्पयितुं कस्याप्यधिकारो नास्ति, कैसरस्य निकटे मम विचारो भवतु। 12 तदा झीष्टो मन्त्रिभिः सार्द्धं संमन्थ्य पौलाय कथितवान्, कैसरस्य निकटे किं तव विचारो भविष्यति? कैसरस्य समीपं गमिष्यसि। 13 कियदिनेभ्यः परम् आग्निप्यराजा बार्सीकी य झीष्टं साक्षात् कर्तुं कैसरियानगरम् आगतवन्तौ। 14 तदा तौ बहुदिनानि तत्र

स्थितौ ततः झीष्टस्तं राजानं पौलस्य कथां विज्ञाप्य कथयितुम् आरभत
 पौलनामानम् अकें बन्दि झीलिक्षो बद्धं संस्थाप्य गतवान्। 15 यिज्ञशालमि
 मम स्थितिकाले मढयाजको यिडूढीयानां प्राथीनलोकश्च तम् अपोध तम्प्रति
 ढरडाज्ञां प्रार्थयन्त। 16 ततोऽहम् ँत्युत्तरम् अवढं यावद् अपोढितो जनः
 स्वापवाढकान् साक्षात् कृत्वा स्वस्मिन् योऽपराध आरोपितस्तस्य प्रत्युत्तरं
 ढातुं सुयोगं न प्राप्नोति, तावत्कालं कस्यापि मानुषस्य प्राणनाशाज्ञापनं
 रोमिलोकानां रीति न्हि। 17 ततस्तेष्वत्रागतेषु परस्मिन् द्विवसेऽहम्
 अविलम्बं विचारसन् उपविश्य तं मानुषम् आनेतुम् आज्ञापयम्।
 18 तदनन्तरं तस्यापवाढका उपस्थाय यादृशम् अढं यिन्तितवान् तादृशं
 कञ्चन मढापवाढं नोत्थाप्य 19 स्वेषां मते तथा पौलो यं सञ्चवं वढति
 तस्मिन् यीशुनामनि मृतजने य तस्य विरुद्धं कथितवन्तः। 20 ततोऽहं
 तादृग्वियारे संशयानः सन् कथितवान् त्वं यिज्ञशालमं गत्वा किं तत्र
 विचारितो भवितुम् ँच्छसि? 21 तढा पौलो मढाराजस्य निकटे विचारितो
 भवितुं प्रार्थयत, तस्माद् यावत्कालं तं कैसरस्य समीपं प्रेषयितुं न शकनोमि
 तावत्कालं तमत्र स्थापयितुम् आढिष्टवान्। 22 तत आग्रिप्पः झीष्टम्
 उक्तवान्, अढमपि तस्य मानुषस्य कथां श्रोतुम् अभिलषामि। तढा झीष्टो
 व्याडरत् श्वस्तढीयां कथां त्वं श्रोष्यसि। 23 परस्मिन् द्विवसे आग्रिप्पो
 भार्गीकी य मढासमागमं कृत्वा प्रधानवाढिनीपतिमि नगरस्थप्रधानलोकैश्च
 सढ मिलित्वा राजगृढमागत्य समुपस्थितौ तढा झीष्टस्याज्ञया पौल
 आनीतोऽभवत्। 24 तढा झीष्टः कथितवान् ढे राजन् आग्रिप्प ढे उपस्थिताः
 सर्वे लोका यिज्ञशालमनगरे यिडूढीयलोकसमूढो यस्मिन् मानुषे मम समीपे
 निवेढनं कृत्वा प्रोच्यैः कथामिमां कथितवान् पुनरल्पकालमपि तस्य ज्वनं
 नोचितं तमेतं मानुषं पश्यत। 25 किन्तवेष जनः प्राणनाशढं किमपि
 कर्म्म न कृतवान् ँत्यजानां तथापि स मढाराजस्य सन्निधौ विचारितो
 भवितुं प्रार्थयत तस्मात् तस्य समीपं तं प्रेषयितुं मतिमकरवम्। 26 किन्तु
 श्रीयुक्तस्य समीपम् अेतस्मिन् किं लेभनीयम् ँत्यस्य कस्ययिन् निर्णयस्य
 न जातत्वाद् अेतस्य विचारे सति यथाढं लेभितुं किञ्चन निश्चितं प्राप्नोमि
 तढर्थं युष्माकं समक्षं विशेषतो ढे आग्रिप्पराज भवतः समक्षम् अेतम्

આનયે| 27 યતો બન્દિપ્રેષણસમયે તસ્યાભિયોગસ્ય કિન્નિદલેખનમ્
અહમ્ અયુક્તં જાનામિ|

26 તત આગ્નિષ્પ: પૌલમ્ અવાદીત્, નિજાં કથાં કથયિતું તુભ્યમ્ અનુમતિ
દીયતે| તસ્માત્ પૌલ: કરં પ્રસાર્થ્ય સ્વસ્મિન્ ઉત્તરમ્ અવાદીત્| 2 હે
આગ્નિષ્પરાજ યત્કારણાદહં ચિહ્નૈયૈરપવાદિતો ડભવં તસ્ય વૃત્તાન્તમ્
અધ ભવત: સાક્ષાન્ નિવેદયિતુમનુમતોહમ્ ઇદં સ્વીયં પરમં ભાગ્યં
મન્યે; 3 યતો ચિહ્નૈયલોકાનાં મધ્યે યા યા રીતિ: સૂક્ષ્મવિચારાશ્ચ સન્તિ
તેષુ ભવાન્ વિજાતમઃ; અતએવ પ્રાર્થયે ધૈર્યમવલમ્બ્ય મમ નિવેદનં
શૃણોતુ| 4 અહં ચિહ્નૈયલોકાને સ્વદેશીયલોકાનાં મધ્યે તિષ્ઠન્ આ
યૌવનકાલાદ્ યદ્દૂપમ્ આચરિતવાન્ તદ્ ચિહ્નૈયલોકા: સર્વે વિદન્તિ| 5
અસ્માકં સર્વેભ્ય: શુદ્ધતમં યત્ કિન્નૈયમતં તદવલમ્બી ભૂત્વાહં કાલં
યાપિતવાન્ યે જના આ બાલ્યકાલાન્ માં જાનાન્તિ તે એતાદૃશં સાક્ષ્યં યદિ
દદાતિ તર્હિ દાતું શક્નુવન્તિ| 6 કિન્તુ હે આગ્નિષ્પરાજ ઇશ્વરોડસ્માકં
પૂર્વપુરુષાણાં નિકટે યદ્ અક્ષીકૃતવાન્ તસ્ય પ્રત્યાશાહેતોરહમ્ ઇદાનીં
વિચારસ્થાને દાડાયમાનોસ્મિ| 7 તસ્યાક્ષીકારસ્ય ફલં પ્રાપ્તુમ્ અસ્માકં
દ્વાદશવંશા દિવાનિશં મહાયત્નાદ્ ઇશ્વરસેવનં કૃત્વા યાં પ્રત્યાશાં કુર્વન્તિ
તસ્યા: પ્રત્યાશાયા હેતોરહં ચિહ્નૈયૈરપવાદિતોડભવમ્| 8 ઇશ્વરો
મૃતાન્ ઉત્થાપયિષ્યતીતિ વાક્યં યુષ્માકં નિકટેડસમ્ભવં કુતો ભવેત્?
9 નાસરતીયયીશો નામ્નો વિરુદ્ધં નાનાપ્રકારપ્રતિકૂલાચરણમ્ ઉચિતમ્
ઇત્યહં મનસિ યથાર્થં વિજ્ઞાય 10 ચિહ્નૈયલોકાને તદ્દેશવં ફલત:
પ્રધાનયાજકસ્ય નિકટાત્ ક્ષમતાં પ્રાપ્ય બહૂન્ પવિત્રલોકાન્ કારાયાં બદ્ધવાન્
વિશેષતસ્તેષાં હનનસમયે તેષાં વિરુદ્ધાં નિજાં સમ્મતિં પ્રકાશિતવાન્|
11 વારં વારં ભજનભવનેષુ તેભ્યો દાડં પ્રદત્તવાન્ બલાત્ તં ધર્મં
નિન્દયિતવાંશ્ચ પુનશ્ચ તાન્ પ્રતિ મહાક્રોધાદ્ ઉન્મત્ત: સન્ વિદેશીયનગરાણિ
યાવત્ તાન્ તાડિતવાન્| 12 ઇત્યં પ્રધાનયાજકસ્ય સમીપાત્ શક્તિમ્
આજ્ઞાપત્રઞ્ચ લબ્ધ્વા દમ્ભેષકનગરં ગતવાન્| 13 તદાહં હે રાજન્ માર્ગમધ્યે
મધ્યાહ્નકાલે મમ મદીયસક્ષિનાં લોકાનાઞ્ચ યતસૃષુ દિક્ષુ ગગણાત્ પ્રકાશમાનાં
ભાસ્કરતોપિ તેજસ્વતીં દીપ્તિં દૃષ્ટવાન્| 14 તસ્માદ્ અસ્માસુ સર્વેષુ
ભૂમૌ પતિતેષુ સત્સુ હે શૌલ હૈ શૌલ કુતો માં તાડયસિ? કણ્ટકાનાં મુખે

પાદાહનનં તવ દુઃસાધ્યમ્ ઇબ્રીયભાષયા ગદિત એતાદૃશ એકઃ શબ્દો મયા
 શ્રુતઃ | 15 તદાહં પૃષ્ટવાન્ હે પ્રભો કો ભવાન્? તતઃ સ કથિતવાન્ યં ચીશું
 ત્વં તાડયસિ સોહં, 16 કિન્તુ સમુત્તિષ્ટ ત્વં યદ્ દૃષ્ટવાન્ ઇતઃ પુનઃચ યદ્યત્
 ત્વાં દર્શયિષ્યામિ તેષાં સર્વેષાં કાર્યાર્ણાં ત્વાં સાક્ષિણં મમ સેવકઞ્ચ કર્તુમ્
 દર્શનમ્ અદામ્ | 17 વિશેષતો યિહૂદીયલોકેભ્યો ભિન્નજાતીયેભ્યશ્ચ ત્વાં
 મનોનીતં કૃત્વા તેષાં યથા પાપમોચનં ભવતિ 18 યથા તે મયિ વિશ્વસ્ય
 પવિત્રીકૃતાનાં મધ્યે ભાગં પ્રાપ્નુવન્તિ તદભિપ્રાયેણ તેષાં જ્ઞાનયક્ષ્મ્પિ
 પ્રસન્નાનિ કર્તુ તથાન્ધકારાદ્ દીપ્તિં પ્રતિ શૈતાનાધિકારાચ્ચ ઇશ્વરં પ્રતિ
 મતીઃ પરાવર્તયિતું તેષાં સમીપં ત્વાં પ્રેષ્યામિ | 19 હે આગ્રિપ્પરાજ એતાદૃશં
 સ્વર્ગીયપ્રત્યાદેશં અગ્રાહ્યમ્ અકૃત્વાહં 20 પ્રથમતો દમ્બેષકનગરે તતો
 યિરૂશાલમિ સર્વસ્મિન્ યિહૂદીયદેશે અન્યેષુ દેશેષુ ય યેન લોકા મતિં
 પરાવર્ત્ય ઇશ્વરં પ્રતિ પરાવર્તયન્તે, મનઃપરાવર્તનયોગ્યાનિ કર્મ્માણિ ચ
 કુર્વન્તિ તાદૃશમ્ ઉપદેશં પ્રચારિતવાન્ | 21 એતત્કારણાદ્ યિહૂદીયા
 મધ્યેમન્દિરં માં ધૃત્વા હન્તુમ્ ઉદ્યતાઃ | 22 તથાપિ ખ્રીષ્ઠો દુઃખં ભુક્ત્વા
 સર્વેષાં પૂર્વે શ્મશાનાદ્ ઉત્થાય નિજદેશીયાનાં ભિન્નદેશીયાનાઞ્ચ સમીપે
 દીપ્તિં પ્રકાશયિષ્યતિ 23 ભવિષ્યદ્વાદિગણો મૂસાશ્ચ ભાવિકાર્યસ્ય ચદિદં
 પ્રમાણમ્ અદદુરેતદ્ વિનાન્યાં કથાં ન કથયિત્વા ઇશ્વરાદ્ અનુગ્રહં લબ્ધ્વા
 મહતાં ક્ષુદ્રાણાઞ્ચ સર્વેષાં સમીપે પ્રમાણં દત્ત્વાધ યાવત્ તિષ્ઠામિ | 24
 તસ્યમાં કથાં નિશમ્ય ફીષ્ટ ઉચ્ચેઃ સ્વરેણ કથિતવાન્ હે પૌલ ત્વમ્ ઉન્મત્તોસિ
 બહુવિદ્યાભ્યાસેન ત્વં હતજ્ઞાનો જાતઃ | 25 સ ઉક્તવાન્ હે મહામહિમ ફીષ્ટ
 નાહમ્ ઉન્મત્તઃ કિન્તુ સત્યં વિવેચનીયઞ્ચ વાક્યં પ્રસ્તૌમિ | 26 યસ્ય સાક્ષાદ્
 અક્ષોભઃ સન્ કથાં કથયામિ સ રાજા તદ્વૃતાન્તં જાનાતિ તસ્ય સમીપે કિમપિ
 ગુપ્તં નેતિ મયા નિશ્ચિતં બુદ્ધ્યતે યતસ્તદ્ વિજને ન કૃતં | 27 હે આગ્રિપ્પરાજ
 ભવાન્ કિં ભવિષ્યદ્વાદિગણોક્તાનિ વાક્યાનિ પ્રત્યેતિ? ભવાન્ પ્રત્યેતિ તદહં
 જાનામિ | 28 તત આગ્રિપ્પઃ પૌલમ્ અભિહિતવાન્ ત્વં પ્રવૃત્તિં જનયિત્વા
 પ્રાયેણ મામપિ ખ્રીષ્ટીયં કરોષિ | 29 તતઃ સોડવાદીત્ ભવાન્ યે યે લોકાશ્ચ
 મમ કથામ્ અધ શૃણ્વન્તિ પ્રાયેણ ઇતિ નહિ કિન્ત્વેતત્ શૃણ્વલબ્ધનં
 વિના સર્વથા તે સર્વે માદૃશા ભવન્વિવતીશ્વસ્ય સમીપે પ્રાર્થયેડહમ્ | 30
 એતસ્યાં કથાયાં કથિતાયાં સ રાજા સોડધિપતિ બર્ણાકી સભાસ્થા લોકાશ્ચ

तस्माद् उत्थाय 31 गोपने परस्परं विविच्य कथितवन्त ओष ञनो बन्धनार्हं
प्राणान्नार्हं वा किमपि कर्म्म नाकरोत् | 32 तत आग्रिभ्यः झीष्टम् अवदत्,
यधेष मानुषः कैसरस्य निकटे विचारितो भवितुं न प्रार्थयिष्यत् तर्हि मुक्तो
भवितुम् अशक्ष्यत् |

27 जलपथेनास्माकम् एतोलियादेशं प्रति यात्रायां निश्चितायां सत्यां
ते यूलियनाम्नो मडाराजस्य संघातान्तर्गतस्य सेनापतेः समीपे पौलं
तदन्यान् कतिनयजनांश्च समार्पयन् | 2 वयम् आद्रामुत्तीयं पोतमेकम्
आरुह्य आशियादेशस्य तटसमीपेन यातुं मतिं कृत्वा लङ्गरम् उत्थाप्य
पोतम् अमोययाम्; माकिदनियादेशस्थथिषलनीकीनिवास्यारिस्तार्भनामा
कश्चिद् ञनोऽस्माभिः सार्द्धम् आसीत् | 3 परस्मिन् द्विवसे ऽस्माभिः
सीदोन्नगरे पोते लागिते तत्र यूलियः सेनापतिः पौलं प्रति सौजन्यं प्रदर्थ्य
सान्त्वनार्थं बन्धुबान्धवान् उपयातुम् अनुजज्ञौ | 4 तस्मात् पोते भोयिते
सति सम्भुभवायोः सम्भवाद् वयं कुप्रोपद्वीपस्य तीरसमीपेन गतवन्तः |
5 किलिकियायाः पाम्फूलियायाश्च समुद्रस्य पारं गत्वा लूकियादेशान्तर्गतं
मुरानगरम् उपातिष्ठाम | 6 तत्स्थानाद् एतालियादेशं गच्छति यः
सिक्न्दरियानगरस्य पोतस्तं तत्र प्राप्य शतसेनापतिस्तं पोतम् अस्मान्
आरोडयत् | 7 ततः परं बडूनि दिनानि शनैः शनैः गत्वा क्नीदपाश्वोपस्थितः
पूर्वं प्रतिकूलेन पवनेन वयं सल्मोन्याः सम्भुभम् उपस्थाय क्रीत्युपद्वीपस्य
तीरसमीपेन गतवन्तः | 8 कश्चेन तमुत्तीर्य लासेयानगरस्याधः सुन्दरनामकं
भातम् उपातिष्ठाम | 9 एत्थं बहुतिथः कालो यापित उपवासदिनत्रातीतं,
तत्कारणात् नौवर्त्मनि भयङ्करे सति पौलो विनयेन कथितवान्, 10 हे मडेय्य
अहं निश्चयं ञनामि यात्रायामस्याम् अस्माकं क्लेशा बडूनामपययाश्च
भविष्यन्ति, ते केवलं पोतसामर्थ्योरिति नहि, किन्त्वस्माकं प्राणानामपि |
11 तदा शतसेनापतिः पौलोक्तवाक्यतोपि कर्णधारस्य पोतवशिजश्च
वाक्यं बहुभंस्त | 12 तत् भातं शीतकाले वासार्हस्थानं न तस्माद्
अवाचीप्रतीयोर्दिशोः क्रीत्याः क्नीकियभातं यातुं यदि शक्नुवन्तस्तर्हि तत्र
शीतकालं यापयितुं प्रायेण सर्व्वं मन्त्रयामासुः | 13 ततः परं दक्षिणवायु भ्रंष्टं
वडतीति विलोक्य निजाभिप्रायस्य सिद्धेः सुयोगो भवतीति बुद्ध्वा पोतं
भोययित्वा क्रीत्युपद्वीपस्य तीरसमीपेन यलितवन्तः | 14 किन्त्वल्पक्षणात्

परमेव उरकलुदोन्नामा प्रतिकूलः प्रयादो वायु र्बलन् पोतेऽलगीत् 15
 तस्याभिमुभं गन्तुम् पोतस्याशक्तत्वाद् वयं वायुना स्वयं नीताः | 16
 अनन्तरं कलौदीनाम्न उपद्वीपस्य कूलसमीपेन पोतं गमयित्वा बडुना
 कष्टेन क्षुद्रनावम् अरक्षाम | 17 ते तामारुह्य रज्ज्व्या पोतस्याधोभागम्
 अबधन् तदनन्तरं येत् पोतो सैकते लगतीति भयाद् वातवसनान्यमोययन्
 ततः पोतो वायुना यालितः | 18 किन्तु क्रमशो वायोः प्रबलत्वात् पोतो
 दोलायमानोऽभवत् परस्मिन् द्विवसे पोतस्थानि कतिपयानि द्रव्याणि
 तोये निक्षिप्तानि | 19 तृतीयदिवसे वयं स्वडस्तैः पोतसज्जनद्रव्याणि
 निक्षिप्तवन्तः | 20 ततो बडुद्विनानि यावत् सूर्यनक्षत्रादीनि समाच्छन्नानि
 ततो ऽतीव वात्यागमाद् अस्माकं प्राणरक्षायाः कापि प्रत्याशा नातिष्ठत् |
 21 बडुद्विनेषु लोकेरनादारेण यापितेषु सर्वेषां साक्षत् पौलस्तिष्ठन्
 अकथयत्, हे महेच्छाः क्रीत्युपद्वीपात् पोतं न मोययितुम् अहं पूर्वं
 यद् अवदं तद्ग्रहणं युष्माकम् उचितम् आसीत् तथा कृते युष्माकम्
 अेषा विपद् अेषोऽपययश्च नाघटिष्येताम् | 22 किन्तु साम्प्रतं युष्मान्
 विनीय अवीभ्यदं, यूयं न क्षुब्धत युष्माकम् अेकस्यापि प्राणिनो हानिर्न
 भविष्यति, केवलस्य पोतस्य हानिर्भविष्यति | 23 यतो यस्येश्वरस्य
 लोकोऽहं यत्राहं परियरामि तदीय अंको दूतो ह्यो रात्रौ ममान्तिके तिष्ठन्
 कथितवान्, 24 हे पौल मा भैषीः कैसरस्य सम्भुषे त्वयोपस्थातव्यं;
 तवैतान् सङ्गिनो लोकान् एश्वरस्तुभ्यं दत्तवान् | 25 अतश्चेव हे महेच्छा
 यूयं स्थिरमनसो भवत मह्यं या कथाकथि सावश्यं घटिष्यते ममैतादृशी
 विश्वास एश्वरे विधत्ते, 26 किन्तु कस्यचिद् उपद्वीपस्योपरि पतितव्यम्
 अस्माभिः | 27 ततः परम् आद्रियासमुद्रे पोतस्तथैव दोलायमानः सन्
 एतस्ततो गच्छन् यतुर्दृशदिवसस्य रात्रे द्वितीयप्रहरसमये कस्यचित्
 स्थलस्य समीपमुपतिष्ठतीति पोतीयलोका अन्वमन्थन्त | 28 ततस्ते जलं
 परिमाय तत्र विंशति व्यामा जलानीति ज्ञातवन्तः | किञ्चिद्दूरं गत्वा पुनरपि
 जलं परिमितवन्तः | तत्र पञ्चदश व्यामा जलानि दृष्ट्वा 29 येत् पाषाणे
 लगतीति भयात् पोतस्य पश्चाद्भागतश्चतुरो लङ्गरान् निक्षिप्य दिवाकरम्
 अपेक्ष्य सर्वे स्थितवन्तः | 30 किन्तु पोतीयलोकाः पोताग्रभागे लङ्गरनिक्षेपं
 छलं कृत्वा जलधौ क्षुद्रनावम् अवरोह्य पलायितुम् अयेष्टन्त | 31 ततः

પૌલ: સેનાપતયે સૈન્યગણાય ચ કથિતવાન્, એતે યદિ પોતમધ્યે ન તિષ્ઠન્તિ તર્હિ યુષ્માકં રક્ષાણં ન શક્યં | 32 તદા સેનાગણો રજજૂન્ છિત્વા નાવં જલે પતિતુમ્ અદદાત્ | 33 પ્રભાતસમયે પૌલ: સર્વ્યાન્ જનાન્ ભોજનાર્થં પ્રાર્થ્યં વ્યાહરત્, અધ ચતુર્દશદિનાનિ યાવદ્ યૂયમ્ અપેક્ષમાના અનાહારા: કાલમ્ અચાપયત કિમપિ નાભુંગ્ધં | 34 અતો વિનયેડહં ભક્ષ્યં ભુજ્યતાં તતો યુષ્માકં મજ્જલં ભવિષ્યતિ, યુષ્માકં કસ્યચિજ્જનસ્ય શિરસ: કેશૈકોપિ ન નંક્ષ્યતિ | 35 ઇતિ વ્યાહૃત્ય પૌલં પૂપં ગૃહીત્વેશ્વરં ધન્યં ભાષમાણસ્તં ભંકત્વા ભોક્તુમ્ આરબ્ધવાન્ | 36 અનન્તરં સર્વ્યે ચ સુસ્થિરા: સન્ત: ખાધાનિ પર્યગૃહ્ણન્ | 37 અસ્માકં પોતે ષટ્સપ્તત્યધિકશતદ્વયલોકા આસન્ | 38 સર્વ્યેષુ લોકેષુ યથેષ્ટં ભુક્તવત્સુ પોતસ્થન્ ગોધૂમાન્ જલધૌ નિક્ષિપ્ય તૈ: પોતસ્ય ભારો લઘૂકૃત: | 39 દિને જાતેડપિ સ કો દેશ ઇતિ તદા ન પર્યચીયત; કિન્તુ તત્ર સમતટમ્ એકં ખાતં દૃષ્ટ્વા યદિ શકનુમસ્તર્હિ વચં તસ્યાભ્યન્તરં પોતં ગમયામ ઇતિ મર્તિં કૃત્વા તે લજ્જરાન્ છિત્વા જલધૌ ત્યક્તવન્ત: | 40 તથા કર્ણબન્ધનં મોચયિત્વા પ્રધાનં વાતવસનમ્ ઉત્તોલ્ય તીરસમીપં ગતવન્ત: | 41 કિન્તુ દ્વયો: સમુદ્રયો: સજ્મસ્થાને સૈકતોપરિ પોતે નિક્ષિપ્તે ડગ્રભાગે બાધિતે પશ્ચાદ્ભાગે પ્રબલતરજ્જોડલગત્ તેન પોતો ભગ્ન: | 42 તસ્માદ્ બન્દયશ્ચેદ્ બાહુભિસ્તરન્ત: પલાયન્તે ઇત્યાશક્રુયા સેનાગણસ્તાન્ હન્તુમ્ અમન્ત્રયત્; 43 કિન્તુ શતસેનાપતિ: પૌલં રક્ષિતું પ્રયત્નં કૃત્વા તાન્ તચ્ચેષ્ટાયા નિવર્ત્ય ઇત્યાદિષ્ટવાન્, યે બાહુતરણં જાનન્તિ તેડગ્રે પ્રોલ્લમ્બ્ય સમુદ્રે પતિત્વા બાહુભિસ્તીર્ત્વા કૂલં યાન્તુ | 44 અપરમ્ અવશિષ્ટા જના: કાષ્ઠં પોતીયં દ્રવ્યં વા યેન યત્ પ્રાપ્યતે તદવલમ્બ્ય યાન્તુ; ઇત્યં સર્વ્યે ભૂમિં પ્રાપ્ય પ્રાણૈ જીવિતા: |

28 ઇત્યં સર્વ્યેષુ રક્ષાં પ્રાપ્તેષુ તત્રત્યોપદ્વીપસ્ય નામ મિલીતેતિ તે જ્ઞાતવન્ત: | 2 અસભ્યલોકા યથેષ્ટમ્ અનુકમ્પાં કૃત્વા વર્તમાનવૃષ્ટે: શીતાચ્ય વહ્નિં પ્રજ્જવાલ્યાસ્માકમ્ આતિથ્યમ્ અકુર્વન્ | 3 કિન્તુ પૌલ ઇન્ધનાનિ સંગૃહ્ય યદા તસ્મિન્ અગ્રૌ નિરક્ષિપત્, તદા વહ્ને: પ્રતાપાત્ એક: કૃષ્ણસર્પો નિર્ગત્ય તસ્ય હસ્તે દ્રષ્ટવાન્ | 4 તેડસભ્યલોકાસ્તસ્ય હસ્તે સર્પમ્ અવલમ્બમાનં દૃષ્ટ્વા પરસ્પરમ્ ઉક્તવન્ત એષ જનોડવશ્યં નરહા ભવિષ્યતિ, યતો યદપિ જલધે રક્ષાં પ્રાપ્તવાન્ તથાપિ પ્રતિકૂલદાયક એનં

જીવિતું ન દદાતિ | 5 કિન્તુ સ હસ્તં વિધુન્વન્ તં સર્પમ્ અગ્નિમધ્યે નિક્ષિપ્ય
 કામપિ પીડાં નાપ્તવાન્ | 6 તતો વિષજવાલયા એતસ્ય શરીરં સ્ફીતં
 ભવિષ્યતિ યદ્વા હઠાદયં પ્રાણાન્ ત્યક્ષ્યતીતિ નિશ્ચિત્ય લોકા બહુક્ષણાનિ
 યાવત્ તદ્ દ્રષ્ટું સ્થિતવન્તઃ કિન્તુ તસ્ય કસ્યાશ્ચિદ્ વિપદોઽઘટનાત્ તે
 તદ્વિપરીતં વિજ્ઞાય ભાષિતવન્ત એષ કશ્ચિદ્ દેવો ભવેત્ | 7 પુબ્લિયનામા
 જન એકસ્તસ્યોપદ્વીપસ્યાધિપતિરાસીત્ તત્ર તસ્ય ભૂમ્યાદિ ચ સ્થિતં |
 સ જનોઽસ્માન્ નિજગૃહં નીત્વા સૌજન્યં પ્રકાશ્ય દિનત્રયં યાવદ્ અસ્માકં
 આતિથ્યમ્ અકરોત્ | 8 તદા તસ્ય પુબ્લિયસ્ય પિતા જ્વરાતિસારેણ
 પીડયમાનઃ સન્ શય્યાયામ્ આસીત્; તતઃ પૌલસ્તસ્ય સમીપં ગત્વા
 પ્રાર્થનાં કૃત્વા તસ્ય ગાત્રે હસ્તં સમર્પ્ય તં સ્વસ્થં કૃતવાન્ | 9 ઇત્યં
 ભૂતે તદ્વીપનિવાસિન ઇતરેપિ રોગિલોકા આગત્ય નિરામયા અભવન્ |
 10 તસ્માત્તેઽસ્માકમ્ અતીવ સત્કારં કૃતવન્તઃ, વિશેષતઃ પ્રસ્થાનસમયે
 પ્રયોજનીયાનિ નાનદ્રવ્યાણિ દત્તવન્તઃ | 11 ઇત્યં તત્ર ત્રિષુ માસેષુ ગતેષુ
 યસ્ય ચિહ્નં દિયસ્કૂરી તાદૃશ એકઃ સિકન્દરીયનગરસ્ય પોતઃ શીતકાલં
 યાપયન્ તસ્મિન્ ઉપદ્વીપે ડતિષ્ઠત્ તમેવ પોતં વયમ્ આરુહ્ય યાત્રામ્ અકુર્મ |
 12 તતઃ પ્રથમતઃ સુરાકૂસનગરમ્ ઉપસ્થાય તત્ર ત્રીણિ દિનાનિ સ્થિતવન્તઃ |
 13 તસ્માદ્ આવૃત્ય રોગિયનગરમ્ ઉપસ્થિતાઃ દિનેઽસ્માત્ પરં દક્ષિણવયૌ
 સાનુકૂલ્યે સતિ પરસ્મિન્ દિવસે પતિયલીનગરમ્ ઉપાતિષ્ઠામ | 14
 તતોઽસ્માસુ તત્રત્યં ભ્રાતૃગણં પ્રાપ્તેષુ તે સ્યૈઃ સાર્દ્ધમ્ અસ્માન્ સપ્ત દિનાનિ
 સ્થાપયિતુમ્ અચતન્ત, ઇત્યં વયં રોમાનગરમ્ પ્રત્યગચ્છામ | 15 તસ્માત્
 તત્રત્યાઃ ભ્રાતરોઽસ્માકમ્ આગમનવાર્તાં શ્રુત્વા આપ્પિયફરં ત્રિષ્ટાવર્ણીઞ્ચ
 યાવદ્ અગ્રેસરાઃ સન્તોસ્માન્ સાક્ષાત્ કર્તુમ્ આગમન્; તેષાં દર્શનાત્
 પૌલ ઈશ્વરં ધન્યં વદન્ આશ્વાસમ્ આપ્તવાન્ | 16 અસ્માસુ રોમાનગરં
 ગતેષુ શતસેનાપતિઃ સર્વાન્ બન્દીન્ પ્રધાનસેનાપતેઃ સમીપે સમર્પયત્
 કિન્તુ પૌલાય સ્વરક્ષકપદાતિના સહ પૃથગ્ વસ્તુમ્ અનુમર્તિ દત્તવાન્ |
 17 દિનત્રયાત્ પરં પૌલસ્તદેશસ્થાન્ પ્રધાનચિહ્નુદિન આહૂતવાન્ તતસ્તેષુ
 સમુપસ્થિતેષુ સ કથિતવાન્, હે ભ્રાતૃગણ નિજલોકાનાં પૂર્વપુરુષાણાં વા
 રીતે વિપરીતં કિઞ્ચન કર્માહં નાકરવં તથાપિ ચિરુશાલભનિવાસિનો લોકા
 માં બર્હિં કૃત્વા રોમિલોકાનાં હસ્તેષુ સમર્પિતવન્તઃ | 18 રોમિલોકા વિચાર્ય

મમ પ્રાણહનનાર્હ કિમપિ કારણં ન પ્રાપ્ય માં મોચયિતુમ્ ઐચ્છન્ઃ 19 કિન્તુ
 ચિહ્નલોકાનામ્ આપત્યા મયા કૈસરરાજસ્ય સમીપે વિચારસ્ય પ્રાર્થના
 કર્તવ્યા જાતા નોચેત્ નિજદેશીયલોકાન્ પ્રતિ મમ કોપ્યભિયોગો નાસ્તિ |
 20 એતત્કારણાદ્ અહં યુષ્માન્ દ્રષ્ટું સંલપિતુઞ્ચાહૂયમ્ ઇસ્રાયેલ્વશીયાનાં
 પ્રત્યાશાહેતોહમ્ એતેન શુદ્ધભલેન બદ્ધોડભવમ્ | 21 તદા તે તમ્ અવાદિષુઃ,
 ચિહ્નદીયદેશાદ્ વયં ત્વામધિ કિમપિ પત્રં ન પ્રાપ્તા યે ભ્રાતરઃ સમાચાતાસ્તેષાં
 કોપિ તવ કામપિ વાર્તા નાવદત્ અભદ્રમપિ નાકથયચ્ચ | 22 તવ મતં કિમિતિ
 વયં ત્વત્તઃ શ્રોતુમિચ્છામઃ | યદ્ ઇદં નવીનં મતમુત્થિતં તત્ સર્વત્ર સર્વેષાં
 નિકટે નિન્દિતં જાતમ ઇતિ વયં જાનીમઃ | 23 તૈસ્તદર્થમ્ એકસ્મિન્ દિને
 નિરૂપિતે તસ્મિન્ દિને બહવ એકત્ર મિલિત્વા પૌલસ્ય વાસગૃહમ્ આગચ્છન્
 તસ્માત્ પૌલ આ પ્રાતઃકાલાત્ સન્ધ્યાકાલં યાવન્ મૂસાવ્યવસ્થાગ્રન્થાદ્
 ભવિષ્યદ્વાદિનાં ગ્રન્થેભ્યશ્ચ યીશોઃ કથામ્ ઉત્થાપ્ય ઇશ્વરસ્ય રાજ્યે
 પ્રમાણં દત્વા તેષાં પ્રવૃત્તિં જનયિતું ચેષ્ટિતવાન્ | 24 કેચિતુ તસ્ય કથાં
 પ્રત્યાયન્ કેચિતુ ન પ્રત્યાયન્ઃ 25 એતત્કારણાત્ તેષાં પરસ્પરમ્ અનૈક્યાત્
 સર્વે ચલિતવન્તઃ; તથાપિ પૌલ એતાં કથામેકાં કથિતવાન્ પવિત્ર આત્મા
 યિશયિયસ્ય ભવિષ્યદ્વક્તુ વદનાદ્ અસ્માકં પિતૃપુરુષેભ્ય એતાં કથાં ભદ્રં
 કથયામાસ, યથા, 26 "ઉપગત્ય જનાનેતાન્ ત્વં ભાષસ્વ વચસ્તિવદં | કર્ણોઃ
 શ્રોષ્યથ યૂયં હિ કિન્તુ યૂયં ન ભોત્સ્યથ | નેત્રૈ દ્રક્ષ્યથ યૂયન્ન જ્ઞાતું યૂયં ન
 શક્ષ્યથ | 27 તે માનુષા યથા નેત્રૈઃ પરિપશ્યન્તિ નૈવ હિ | કર્ણોઃ યથા ન
 શૃણ્વન્તિ બુદ્ધ્યન્તે ન ચ માનસૈઃ | વ્યાવર્તયત્સુ ચિત્તાનિ કાલે કુત્રાપિ તેષુ
 વૈ | મત્તસ્તે મનુજાઃ સ્વસ્થા યથા નૈવ ભવન્તિ ચ | તથા તેષાં મનુષ્યાણાં
 સન્તિ સ્થૂલા હિ બુદ્ધયઃ | બધિરીભૂતકર્ણાશ્ચ જાતાશ્ચ મુદ્રિતા દૃશઃ | | 28
 અત ઇશ્વરાદ્ યત્ પરિત્રાણં તસ્ય વાર્તા ભિન્નદેશીયાનાં સમીપં પ્રેષિતા
 તએવ તાં ગ્રહીષ્યન્તીતિ યૂયં જાનીત | 29 એતાદૃશ્યાં કથાયાં કથિતાયાં
 સત્યાં ચિહ્નદિનઃ પરસ્પરં બહુવિચારં કુર્વન્તો ગતવન્તઃ | 30 ઇત્યં પૌલઃ
 સમ્પૂર્ણ વત્સરદ્વયં યાવદ્ ભાટકીયે વાસગૃહે વસન્ યે લોકાસ્તસ્ય સન્નિધિમ્
 આગચ્છન્તિ તાન્ સર્વાનેવ પરિગૃહ્ણન્ઃ 31 નિર્વિઘ્નમ્ અતિશયનિઃક્ષોભમ્
 ઇશ્વરીયરાજત્વસ્ય કથાં પ્રચારયન્ પ્રભૌ યીશૌ ખ્રીષ્ટે કથાઃ સમુપાદિશત્ |
 ઇતિ | |

રોમિણ:

1 ઈશ્વરો નિજપુત્રમધિ ચં સુસંવાદં ભવિષ્યદ્વાદિભિ ધર્મગ્રન્થે પ્રતિશ્રુતવાન્
તં સુસંવાદં પ્રચારયિતું પૃથક્કૃત આહૂતઃ પ્રેરિતશ્ચ પ્રભો ચીશુખ્રીષ્ટસ્ય સેવકો
યઃ પૌલઃ 2 સ રોમાનગરસ્થાન્ ઈશ્વરપ્રિયાન્ આહૂતાંશ્ચ પવિત્રલોકાન્ પ્રતિ
પત્રં લિખતિ | 3 અસ્માકં સ પ્રભુ ચીશુઃ ખ્રીષ્ટઃ શારીરિકસમ્બન્ધેન દાયૂદો
વંશોદ્ભવઃ 4 પવિત્રસ્યાત્મનઃ સમ્બન્ધેન ચેશ્વરસ્ય પ્રભાવવાન્ પુત્ર ઇતિ
શ્મશાનાત્ તસ્યોત્થાનેન પ્રતિપન્નં | 5 અપરં ચેષાં મધ્યે ચીશુના ખ્રીષ્ટેન
યૂયમપ્યાહૂતાસ્તે ડન્યદેશીયલોકાસ્તસ્ય નામ્નિ વિશ્વસ્ય નિદેશગ્રાહિણો
યથા ભવન્તિ 6 તદભિપ્રાયેણ વયં તસ્માદ્ અનુગ્રહં પ્રેરિતત્વપદઞ્ચ પ્રાપ્તાઃ |
7 તાતેનાસ્માકમ્ ઈશ્વરેણ પ્રભુણા ચીશુખ્રીષ્ટેન ચ યુષ્મભ્યમ્ અનુગ્રહઃ
શાન્તિશ્ચ પ્રદીયેતાં | 8 પ્રથમતઃ સર્વસ્મિન્ જગતિ યુષ્માકં વિશ્વાસસ્ય
પ્રકાશિતત્વાદ્ અહં યુષ્માકં સર્વેષાં નિમિત્તં ચીશુખ્રીષ્ટસ્ય નામ ગૃહ્ણન્
ઈશ્વરસ્ય ધન્યવાદં કરોમિ | 9 અપરમ્ ઈશ્વરસ્ય પ્રસાદાદ્ બહુકાલાત્
પરં સામ્પ્રતં યુષ્માકં સમીપં યાતું કથમપિ યત્ સુયોગં પ્રાપ્નોમિ, એતદર્થ
નિરન્તરં નામાન્યુચ્યારયન્ નિજાસુ સર્વપ્રાર્થનાસુ સર્વદા નિવેદયામિ, 10
એતસ્મિન્ યમહં તત્પુત્રીયસુસંવાદપ્રચારણેન મનસા પરિચરામિ સ ઈશ્વરો
મમ સાક્ષી વિધતે | 11 યતો યુષ્માકં મમ ચ વિશ્વાસેન વચમ્ ઉભયે યથા
શાન્તિયુક્તા ભવામ ઇતિ કારણાદ્ 12 યુષ્માકં સ્થૈર્યકરણાર્થ યુષ્મભ્યં
કિન્ચિત્પરમાર્થદાનદાનાય યુષ્માન્ સાક્ષાત્ કર્તુ મદીયા વાઞ્છા | 13 હે
ભ્રાતૃગણા ભિન્નદેશીયલોકાનાં મધ્યે યદ્વત્ તદ્વદ્ યુષ્માકં મધ્યેપિ યથા
ફલં ભુજ્ઞે તદભિપ્રાયેણ મુહુર્મુહુ યુષ્માકં સમીપં ગન્તુમ્ ઉદ્યતોડહં કિન્તુ
યાવદ્ અધ તસ્મિન્ ગમને મમ વિદ્મો જાત ઇતિ યૂયં યદ્ અજ્ઞાતાસ્તિષ્ઠથ
તદહમ્ ઉચિતં ન બુધ્યે | 14 અહં સભ્યાસભ્યાનાં વિદ્વદ્વિદ્વતાઞ્ચ
સર્વેષામ્ ઋણી વિધે | 15 અતએવ રોમાનિવાસિનાં યુષ્માકં સમીપેડપિ
યથાશક્તિ સુસંવાદં પ્રચારયિતુમ્ અહમ્ ઉદ્યતોસ્મિ | 16 યતઃ ખ્રીષ્ટસ્ય
સુસંવાદો મમ લજ્જાસ્પદં નહિ સ ઈશ્વરસ્ય શક્તિસ્વરૂપઃ સન્ આ
ધિહૂદીયેભ્યો ડન્યજાતીયાન્ યાવત્ સર્વજાતીયાનાં મધ્યે યઃ કશ્ચિદ્ તત્ર
વિશ્વસિતિ તસ્યૈવ ત્રાણં જનયતિ | 17 યતઃ પ્રત્યયસ્ય સમપરિમાણમ્
ઈશ્વરદત્તં પુણ્યં તત્સુસંવાદે પ્રકાશતે | તદધિ ધર્મપુસ્તકેપિ લિખિતમિદં

"પુણ્યવાન્ જનો વિશ્વાસેન જીવિષ્યતિ" | 18 અતએવ યે માનવાઃ
 પાપકર્મણા સત્યતાં રુન્ધન્તિ તેષાં સર્વસ્ય દુરાચરણસ્યાધર્મસ્ય ચ
 વિરુદ્ધં સ્વર્ગાદ્ ઈશ્વરસ્ય કોપઃ પ્રકાશતે | 19 યત ઈશ્વરમધિ યદદ્
 જ્ઞેયં તદ્ ઈશ્વરઃ સ્વયં તાન્ પ્રતિ પ્રકાશિતવાન્ તસ્માત્ તેષામ્ અગોચરં
 નહિ | 20 ફલતસ્તસ્થાનન્તશક્તીશ્વરત્વાદીન્યદૃશ્યાન્યપિ સૃષ્ટિકાલમ્
 આરભ્ય કર્મસુ પ્રકાશમાનાનિ દૃશ્યન્તે તસ્માત્ તેષાં દોષપ્રક્ષાલનસ્ય પન્થા
 નાસ્તિ | (āṅdīos g126) 21 અપરમ્ ઈશ્વરં જ્ઞાત્વાપિ તે તમ્ ઈશ્વરજ્ઞાનેન
 નાદ્રિયન્ત કૃતજ્ઞા વા ન જાતાઃ; તસ્માત્ તેષાં સર્વે તર્કા વિફલીભૂતાઃ;
 અપરઞ્ચ તેષાં વિવેકશૂન્યાનિ મનાંસિ તિમિરે મગ્નાનિ | 22 તે સ્વાન્
 જ્ઞાનિનો જ્ઞાત્વા જ્ઞાનહીના અભવન્ 23 અનશ્વરસ્યેશ્વરસ્ય ગૌરવં વિહાય
 નશ્વરમનુષ્યપશુપશ્યુરોગામિપ્રભૃતેરાકૃતિવિશિષ્ટપ્રતિમાસ્તૈરાશ્રિતાઃ | 24
 ઇત્યં ત ઈશ્વરસ્ય સત્યતાં વિહાય મૃષામતમ્ આશ્રિતવન્તઃ સચ્ચિદાનન્દં
 સૃષ્ટિકર્તારં ત્યક્ત્વા સૃષ્ટવસ્તુનઃ પૂજાં સેવાઞ્ચ કૃતવન્તઃ; (aiōn g165) 25
 ઇતિ હેતોરીશ્વરસ્તાન્ કુક્કિયાયાં સમર્પ્ય નિજનિજકુચિન્તાભિલાષાભ્યાં
 સ્વં સ્વં શરીરં પરસ્પરમ્ અપમાનિતં કર્તુમ્ અદદાત્ | 26 ઈશ્વરેણ
 તેષુ ક્વભિલાષે સમર્પિતેષુ તેષાં યોષિતઃ સ્વાભાવિકાચરણમ્ અપહાય
 વિપરીતકૃત્યે પ્રાવર્તન્તઃ; 27 તથા પુરુષા અપિ સ્વાભાવિકયોષિત્સઙ્ગમ્ વિહાય
 પરસ્પરં કામકૃશાનુના દગ્ધાઃ સન્તઃ પુમાંસઃ પુંભિઃ સાકં કુકૃત્યે સમાસજ્ય
 નિજનિજબ્રાન્તેઃ સમુચિતં ફલમ્ અલભન્ત | 28 તે સ્વેષાં મનઃસ્વીશ્વરાય
 સ્થાનં દાતુમ્ અનિચ્છુકાસ્તતો હેતોરીશ્વરસ્તાન્ પ્રતિ દુષ્ટમનસ્કત્યમ્
 અવિહિતક્રિયત્વઞ્ચ દત્તવાન્ | 29 અતએવ તે સર્વે ડન્યાયો વ્યભિચારો
 દુષ્ટત્વં લોભો જિઘાંસા ઈર્ષ્યા વધો વિવાદશ્ચાતુરી કુમતિરિત્યાદિભિ
 દુષ્ટકર્મભિઃ પરિપૂર્ણાઃ સન્તઃ 30 કાર્ણજપા અપવાદિન ઈશ્વરદ્વેષકા
 હિંસકા અહઙ્કારિણ આત્મશલાઘિનઃ કુકર્મોત્પાદકાઃ પિત્રોરાજ્ઞાલઙ્કકા 31
 અવિચારકા નિયમલઙ્કિનઃ સ્નેહરહિતા અતિદ્વેષિણો નિર્દયાશ્ચ જાતાઃ | 32
 યે જના એતાદૃશં કર્મ કુર્વન્તિ તએવ મૃતિયોગ્યા ઈશ્વરસ્ય વિચારમીદૃશં
 જ્ઞાત્વાપિ ત એતાદૃશં કર્મ સ્વયં કુર્વન્તિ કેવલમિતિ નહિ કિન્તુ
 તાદૃશકર્મકારિષુ લોકેષ્વપિ પ્રીયન્તે |

2 હે પરદૂષક મનુષ્ય યઃ કશ્ચન ત્વં ભવસિ તવોત્તરદાનાય પન્થા
 નાસ્તિ યતો યસ્માત્ કર્મણઃ પરસ્ત્વયા દૂષ્યતે તસ્માત્ ત્વમપિ દૂષ્યસે,
 યતસ્તં દૂષયન્નપિ ત્વં તદ્દદ્ આચરસિ | 2 કિન્ત્વેતાદૃગાચારિભ્યો યં
 દાદમ્ ઈશ્વરો નિશ્ચિનોતિ સ યથાર્થ ઇતિ વયં જાનીમઃ | 3 અતએવ
 હે માનુષ ત્વં યાદૃગાચારિણો દૂષયસિ સ્વયં યદિ તાદૃગાચરસિ તર્હિ
 ત્વમ્ ઈશ્વરદાદાત્ પલાયિતું શક્ચસીતિ કિં બુદ્ધ્યસે? 4 અપરં તવ
 મનસઃ પરિવર્તનં કર્તુમ્ ઈશ્વરસ્યાનુગ્રહો ભવતિ તન્ન બુદ્ધ્યા ત્વં કિં
 તદીયાનુગ્રહક્ષમાચિરસહિષ્ણુત્વનિધિં તુચ્છીકરોષિ? 5 તથા સ્વાન્તઃકરણસ્ય
 કઠોરત્વાત્ ખેદરાહિત્યાચ્યેશ્વરસ્ય ન્યાય્યવિચારપ્રકાશનસ્ય ક્રોધસ્ય ચ દિનં
 યાવત્ કિં સ્વાર્થ કોપં સચ્ચિનોષિ? 6 કિન્તુ સ એકૈકમનુજાય તત્કર્મ્માનુસારેણ
 પ્રતિફલં દાસ્યતિ; 7 વસ્તુતસ્તુ યે જના ધૈર્ય ધૃત્વા સત્કર્મ કુર્વન્તો મહિમા
 સત્કારોડમત્વચ્ચૈતાનિ મૃગયન્તે તેભ્યોડનન્તાયુ દાસ્યતિ | (aiōnios g166) 8
 અપરં યે જનાઃ સત્યધર્મમ્ અગૃહીત્વા વિપરીતધર્મમ્ ગૃહ્ણન્તિ તાદૃશા
 વિરોધિજનાઃ કોપં ક્રોધઞ્ચ ભોક્ષ્યન્તે | 9 આ યિહૂદિનોડન્યદેશિનઃ પર્યન્તં
 યાવન્તઃ કુકર્મ્કારિણઃ પ્રાણિનઃ સન્તિ તે સર્વે દુઃખં યાતનાઞ્ચ ગમિષ્યન્તિ;
 10 કિન્તુ આ યિહૂદિનો ભિન્નદેશિપર્યન્તા યાવન્તઃ સત્કર્મ્કારિણો
 લોકાઃ સન્તિ તાન્ પ્રતિ મહિમા સત્કારઃ શાન્તિશ્ચ ભવિષ્યન્તિ | 11
 ઈશ્વરસ્ય વિચારે પક્ષપાતો નાસ્તિ | 12 અલબ્ધવ્યવસ્થાશાસ્ત્રૈ ચૈઃ પાપાનિ
 કૃતાનિ વ્યવસ્થાશાસ્ત્રાલબ્ધત્વાનુરૂપસ્તેષાં વિનાશો ભવિષ્યતિ; કિન્તુ
 લબ્ધવ્યવસ્થાશાસ્ત્રા યે પાપાન્યકુર્વન્ વ્યવસ્થાનુસારાદેવ તેષાં વિચારો
 ભવિષ્યતિ | 13 વ્યવસ્થાશ્રોતાર ઈશ્વરસ્ય સમીપે નિષ્પાપા ભવિષ્યન્તીતિ
 નહિ કિન્તુ વ્યવસ્થાચારિણ એવ સપુણ્યા ભવિષ્યન્તિ | 14 યતો
 ડલબ્ધવ્યવસ્થાશાસ્ત્રા ભિન્નદેશીયલોકા યદિ સ્વભાવતો વ્યવસ્થાનુરૂપાન્
 આચારાન્ કુર્વન્તિ તર્હિલબ્ધશાસ્ત્રાઃ સન્તોડપિ તે સ્વેષાં વ્યવસ્થાશાસ્ત્રમિવ
 સ્વયમેવ ભવન્તિ | 15 તેષાં મનસિ સાક્ષિસ્વરૂપે સતિ તેષાં વિતર્કેષુ
 ચ કદા તાન્ દોષિણઃ કદા વા નિર્દોષાન્ કૃતવત્સુ તે સ્વાન્તર્લિખિતસ્ય
 વ્યવસ્થાશાસ્ત્રસ્ય પ્રમાણં સ્વયમેવ દદતિ | 16 યસ્મિન્ દિને મયા
 પ્રકાશિતસ્ય સુસંવાદસ્યાનુસારાદ્ ઈશ્વરો યીશુખ્રીષ્ટેન માનુષાણામ્
 અન્તઃકરણાનાં ગૂઢાભિપ્રાયાન્ ધૃત્વા વિચારયિષ્યતિ તસ્મિન્ વિચારદિને

तत् प्रकाशिष्यते | 17 पश्य त्वं स्वयं यिडूदीति विष्यातो व्यवस्थोपरि
विश्वासं करोषि, 18 ईश्वरमुद्दिश्य स्वं श्लाघसे, तथा व्यवस्थया शिक्षितो
भूत्वा तस्याभिमतं जानासि, सर्व्वासां कथानां सारं विविक्षे, 19 अपरं
ज्ञानस्य सत्यतायाश्चाकरस्वरूपं शास्त्रं मम समीपे विधत् अतो ऽन्धलोकानां
मार्गदर्शयिता 20 तिमिरस्थितलोकानां मध्ये दीप्तिस्वरूपोऽज्ञानलोकेभ्यो
ज्ञानदाता शिशूनां शिक्षयिताऽभवेति मन्यसे | 21 परान् शिक्षयन् स्वयं स्वं
किं न शिक्षयसि? वस्तुतश्चौर्यनिषेधव्यवस्थां प्रचारयन् त्वं किं स्वयमेव
योरयसि? 22 तथा परदारगमनं प्रतिषेधन् स्वयं किं परदारान् गच्छसि?
तथा त्वं स्वयं प्रतिमाद्वेषी सन् किं मन्दिरस्य द्रव्याणि हरसि? 23 यस्त्वं
व्यवस्थां श्लाघसे स त्वं किं व्यवस्थाम् अवमत्य नेश्वरं सम्मन्यसे? 24
शास्त्रे यथा लिभति "तिन्देशिनां समीपे युष्माकं दोषाद् ईश्वरस्य नाम्नो
निन्दा भवति | " 25 यदि व्यवस्थां पालयसि तर्हि तव त्वच्छेदकिया सङ्गला
भवति; यति व्यवस्थां लङ्घसे तर्हि तव त्वच्छेदोऽत्वच्छेदो भविष्यति | 26
यतो व्यवस्थाशास्त्रादिष्टधर्मायारी पुमान् अत्वच्छेदी सन्नपि किं
त्वच्छेदिनां मध्ये न गणयिष्यते? 27 किन्तु लब्धशास्त्रश्छिन्नत्वङ् य त्वं
यदि व्यवस्थालङ्घनं करोषि तर्हि व्यवस्थापालकाः स्वाभाविकाश्छिन्नत्वयो
लोकास्त्वां किं न दूषयिष्यन्ति? 28 तस्माद् यो बाह्यो यिडूदी स यिडूदी नहि
तथाङ्गस्य यस्त्वच्छेदः स त्वच्छेदो नहि; 29 किन्तु यो जन आन्तरिको यिडूदी
स अेव यिडूदी अपरञ्च केवललिपितया व्यवस्थया न किन्तु मानसिको
यस्त्वच्छेदो यस्य य प्रशंसा मनुष्येभ्यो न भूत्वा ईश्वराद् भवति स अेव
त्वच्छेदः |

3 अपरञ्च यिडूदिनः किं श्रेष्ठत्वं? तथा त्वच्छेदस्य वा किं फलं? 2
सर्व्वथा भडूनि इलानि सन्ति, विशेषत ईश्वरस्य शास्त्रं तेभ्योऽदीयत |
3 कैश्चिद् अविश्वसने कृते तेषाम् अविश्वसनात् किम् ईश्वरस्य
विश्वास्यताया ङानिरुत्पत्स्यते? 4 केनापि प्रकारेण नहि | यद्यपि सर्व्वे
मनुष्या मिथ्यावादिनस्तथापीश्वरः सत्यवादी | शास्त्रे यथा लिपितमास्ते,
अतस्त्वन्तु स्ववाक्येन निर्दोषो हि भविष्यसि | विचारे यैव निष्पापो
भविष्यसि न संशयः | 5 अस्माकम् अन्यायेन यदीश्वरस्य न्यायः
प्रकाशते तर्हि किं वदिष्यामः? अहं मानुषाणां कथामिव कथां कथयामि,

ઈશ્વરઃ સમુચિતં દણ્ડં દત્વા કિમ્ અન્યાયી ભવિષ્યતિ? 6 ઇત્યં ન
 ભવતુ, તથા સતીશ્વરઃ કથં જગતો વિચારયિતા ભવિષ્યતિ? 7 મમ
 મિથ્યાવાક્યવદનાદ્ યદીશ્વરસ્ય સત્યત્વેન તસ્ય મહિમા વદ્ધતે તર્હિ કસ્માદહં
 વિચારેડપરાધિત્વેન ગણ્યો ભવામિ? 8 મજ્જલાર્થં પાપમપિ કરણીયમિતિ
 વાક્યં ત્વયા કુતો નોચ્યતે? કિન્તુ ચૈરુચ્યતે તે નિતાન્તં દણ્ડસ્ય પાત્રાણિ
 ભવન્તિ; તથાપિ તદ્વાક્યમ્ અસ્માભિરપ્યુચ્યત ઇત્યસ્માકં ગ્લાનિં કુર્વન્તઃ
 કિયન્તો લોકા વદન્તિ | 9 અન્યલોકેભ્યો વયં કિં શ્રેષ્ઠાઃ? કદાચન નહિ
 ચતો ચિહ્નુદિનો ડન્યદેશિનશ્ચ સર્વએવ પાપસ્યાયત્તા ઇત્યસ્ય પ્રમાણં
 વયં પૂર્વમ્ અદદામ | 10 લિપિ રથાસ્તે, નૈકોપિ ધાર્મિકો જનઃ | 11
 તથા જ્ઞાનીશ્વરજ્ઞાની માનવઃ કોપિ નાસ્તિ હિ | 12 વિમાર્ગગામિનઃ સર્વે
 સર્વે દુષ્કર્મકારિણઃ | એકો જનોપિ નો તેષાં સાધુકર્મ કરોતિ ચ |
 13 તથા તેષાન્તુ વૈ કણ્ઠા અનાવૃતશ્મશાનવત્ | સ્તુતિવાદં પ્રકુર્વન્તિ
 જિહ્વાભિસ્તે તુ કેવલં | તેષામોષ્ઠસ્ય નિમ્ને તુ વિષં તિષ્ઠતિ સર્પવત્ | 14
 મુખં તેષાં હિ શાપેન કપટેન ચ પૂર્યતે | 15 રક્તપાતાય તેષાં તુ પદાનિ
 ક્ષિપ્રગાનિ ચ | 16 પથિ તેષાં મનુષ્યાણાં નાશઃ કલેશશ્ચ કેવલઃ | 17
 તે જના નહિ જાનન્તિ પન્થાનં સુખદાયિનં | 18 પરમેશાદ્ ભયં યત્તત્
 તચ્ચક્ષુષોરગોચરં | 19 વ્યવસ્થાયાં યદલ્લિખતિ તદ્ વ્યવસ્થાધીનાન્ લોકાન્
 ઉદ્દિશ્ય લિખતીતિ વયં જાનીમઃ | તતો મનુષ્યમાત્રો નિરુત્તરઃ સન્ ઈશ્વરસ્ય
 સાક્ષાદ્ અપરાધી ભવતિ | 20 અતએવ વ્યવસ્થાનુરૂપૈઃ કર્મભિઃ કશ્ચિદપિ
 પ્રાણીશ્વરસ્ય સાક્ષાત્ સપુણ્યીકૃતો ભવિતું ન શક્યતિ યતો વ્યવસ્થયા
 પાપજ્ઞાનમાત્રં જાયતે | 21 કિન્તુ વ્યવસ્થાયાઃ પૃથગ્ ઈશ્વરેણ દેયં યત્
 પુણ્યં તદ્ વ્યવસ્થાયા ભવિષ્યદ્વાદિગણસ્ય ચ વચનૈઃ પ્રમાણીકૃતં સદ્
 ઇદાનીં પ્રકાશતે | 22 યીશુષ્રીષ્ઠે વિશ્વાસકરણાદ્ ઈશ્વરેણ દત્તં તત્ પુણ્યં
 સકલેષુ પ્રકાશિતં સત્ સર્વાન્ વિશ્વાસિનઃ પ્રતિ વર્તતે | 23 તેષાં કોપિ
 પ્રભેદો નાસ્તિ, યતઃ સર્વએવ પાપિન ઈશ્વરીયતેજોહીનાશ્ચ જાતાઃ | 24 ત
 ઈશ્વરસ્યાનુગ્રહાદ્ મૂલ્યં વિના ખ્રીષ્ટકૃતેન પરિત્રાણેન સપુણ્યીકૃતા ભવન્તિ |
 25 યસ્માત્ સ્વશોણિતેન વિશ્વાસાત્ પાપનાશકો બલી ભવિતું સ એવ
 પૂર્વમ્ ઈશ્વરેણ નિશ્ચિતઃ, ઇત્યમ્ ઈશ્વરીયસહિષ્ણુત્વાત્ પુરાકૃતપાપાનાં
 માજ્જનકરણે સ્વીયયાથાર્થ્યં તેન પ્રકાશ્યતે, 26 વર્તમાનકાલીયમપિ

સ્વયાથાર્થ્ય તેન પ્રકાશ્યતે, અપરં યીશૌ વિશ્વાસિનં સપુણ્યીકુર્વન્નપિ સ
 યાથાર્થિકસ્તિષ્ઠતિ | 27 તર્હિ કુત્રાત્મશલાઘા? સા દૂરીકૃતા; કયા વ્યવસ્થયા?
 કિં ક્રિયારૂપવ્યવસ્થયા? ઇત્યં નહિ કિન્તુ તત્ કેવલવિશ્વાસરૂપયા વ્યવસ્થયૈવ
 ભવતિ | 28 અતએવ વ્યવસ્થાનુરૂપાઃ ક્રિયા વિના કેવલેન વિશ્વાસેન
 માનવઃ સપુણ્યીકૃતો ભવિતું શકનોતીત્યસ્ય રાદ્ધાન્તં દર્શયામઃ | 29 સ
 કિં કેવલચિહ્નૈનામ્ ઇશ્વરો ભવતિ? ભિન્નદેશિનામ્ ઇશ્વરો ન ભવતિ?
 ભિન્નદેશિનામપિ ભવતિ; 30 યસ્માદ્ એક ઇશ્વરો વિશ્વાસાત્ ત્વકછેદિનો
 વિશ્વાસેનાત્વકછેદિનશ્ચ સપુણ્યીકરિષ્યતિ | 31 તર્હિ વિશ્વાસેન વયં કિં
 વ્યવસ્થાં લુપ્તામ? ઇત્યં ન ભવતુ વયં વ્યવસ્થાં સંસ્થાપયામ એવ |

4 અસ્માકં પૂર્વપુરુષ ઇબ્રાહીમ્ કાયિકક્રિયા કિં લબ્ધવાન્ એતદધિ કિં
 વદિષ્યામઃ? 2 સ યદિ નિજક્રિયાભ્યઃ સપુણ્યો ભવેત્ તર્હિ તસ્યાત્મશલાઘાં
 કર્તુપન્થા ભવેદિતિ સત્યં, કિન્ત્વીશ્વરસ્ય સમીપે નહિ | 3 શાસ્ત્રે કિં લિખતિ?
 ઇબ્રાહીમ્ ઇશ્વરે વિશ્વસનાત્ સ વિશ્વાસસ્તસ્મૈ પુણ્યાર્થ ગણિતો ભભૂવ | 4
 કર્મકારિણો યદ્ વેતનં તદ્ અનુગ્રહસ્ય ફલં નહિ કિન્તુ તેનોપાર્જિતં મન્તવ્યમ્ |
 5 કિન્તુ યઃ પાપિનં સપુણ્યીકરોતિ તસ્મિન્ વિશ્વાસિનઃ કર્મહીનસ્ય જનસ્ય
 યો વિશ્વાસઃ સ પુણ્યાર્થ ગણ્યો ભવતિ | 6 અપરં યં ક્રિયાહીનમ્ ઇશ્વરઃ
 સપુણ્યીકરોતિ તસ્ય ધન્યવાદં દાયૂદ્ વાર્ણયામાસ, યથા, 7 સ ધન્યોડઘાનિ
 મૃષ્ટાનિ યસ્યાગાંસ્યાવૃતાનિ ચ | 8 સ ય ધન્યઃ પરેશેન પાપં યસ્ય ન ગણ્યતે |
 9 એષ ધન્યવાદસ્ત્વકછેદિનમ્ અત્વકછેદિનં વા કં પ્રતિ ભવતિ? ઇબ્રાહીમો
 વિશ્વાસઃ પુણ્યાર્થ ગણિત ઇતિ વયં વદામઃ | 10 સ વિશ્વાસસ્તસ્ય
 ત્વકછેદિત્વાવસ્થાયાં કિમ્ અત્વકછેદિત્વાવસ્થાયાં કસ્મિન્ સમયે પુણ્યમિવ
 ગણિતઃ? ત્વકછેદિત્વાવસ્થાયાં નહિ કિન્ત્વત્વકછેદિત્વાવસ્થાયાં | 11
 અપરં સ યત્ સર્વેષામ્ અત્વકછેદિનાં વિશ્વાસિનામ્ આદિપુરુષો ભવેત્,
 તે ય પુણ્યવત્ત્વેન ગણ્યેરન્; 12 યે ય લોકાઃ કેવલં છિન્નત્વયો ન સન્તો
 ડસ્મત્પૂર્વપુરુષ ઇબ્રાહીમ્ અછિન્નત્વક સન્ યેન વિશ્વાસમાર્ગેણ ગતવાન્
 તેનૈવ તસ્ય પાદચિહ્નેન ગચ્છન્તિ તેષાં ત્વકછેદિનામપ્યાદિપુરુષો ભવેત્ તદર્થમ્
 અત્વકછેદિનો માનવસ્ય વિશ્વાસાત્ પુણ્યમ્ ઉત્પદત ઇતિ પ્રમાણસ્વરૂપં
 ત્વકછેદચિહ્નં સ પ્રાપ્નોત્ | 13 ઇબ્રાહીમ્ જગતોડધિકારી ભવિષ્યતિ
 યૈષા પ્રતિજ્ઞા તં તસ્ય વંશાત્ પ્રતિ પૂર્વમ્ અક્રિયત સા વ્યવસ્થામૂલિકા

નહિ કિન્તુ વિશ્વાસજન્યપુણ્યમૂલિકા | 14 યતો વ્યવસ્થાવલમ્બિનો
 યદધિકારિણો ભવન્તિ તર્હિ વિશ્વાસો વિક્લો જાયતે સા પ્રતિજ્ઞાપિ
 લુપ્તૈવ | 15 અધિકન્તુ વ્યવસ્થા કોપં જનયતિ યતો ડવિધમાનાયાં
 વ્યવસ્થાયામ્ આજ્ઞાલક્ષ્ણં ન સમ્ભવતિ | 16 અતએવ સા પ્રતિજ્ઞા યદ્
 અનુગ્રહસ્ય ફલં ભવેત્ તદર્થં વિશ્વાસમૂલિકા યતસ્તથાત્વે તદ્વંશસમુદાયં
 પ્રતિ અર્થતો યે વ્યવસ્થયા તદ્વંશસમ્ભવાઃ કેવલં તાન્ પ્રતિ નહિ કિન્તુ ય
 ઇબ્રાહીમીયવિશ્વાસેન તત્સમ્ભવાસ્તાનપિ પ્રતિ સા પ્રતિજ્ઞા સ્થાસ્નુર્ભવતિ |
 17 યો નિર્જીવાન્ સજીવાન્ અવિધમાનાનિ વસ્તૂનિ ય વિધમાનાનિ કરોતિ
 ઇબ્રાહીમો વિશ્વાસભૂમેસ્તસ્યેશ્વરસ્ય સાક્ષાત્ સોડસ્માકં સર્વૈષામ્
 આદિપુરુષ આસ્તે, યથા લિખિતં વિધતે, અહં ત્વાં બહુજાતીનામ્ આદિપુરુષં
 કૃત્વા નિયુક્તવાન્ | 18 ત્વદીયસ્તાદૃશો વંશો જનિષ્યતે યદિદં વાક્યં
 પ્રતિશ્રુતં તદનુસારાદ્ ઇબ્રાહીમ્ બહુદેશીયલોકાનામ્ આદિપુરુષો યદ્
 ભવતિ તદર્થં સોડનપેક્ષિતવ્યમપ્યપેક્ષમાણો વિશ્વાસં કૃતવાન્ | 19
 અપરઞ્ચ ક્ષીણવિશ્વાસો ન ભૂત્વા શતવત્સરવયસ્કત્વાત્ સ્વશરીરસ્ય
 જરાં સારાનામ્નઃ સ્વભાર્યાયા રજોનિવૃત્તિઞ્ચ તૃણાય ન મેને | 20 અપરમ્
 અવિશ્વાસાદ્ ઇશ્વરસ્ય પ્રતિજ્ઞાવચને કમપિ સંશયં ન ચકાર; 21
 કિન્ત્વીશ્વરેણ યત્ પ્રતિશ્રુતં તત્ સાધયિતું શક્યત ઇતિ નિશ્ચિતં વિજ્ઞાય
 દૃઢવિશ્વાસઃ સન્ ઇશ્વરસ્ય મહિમાનં પ્રકાશયાઞ્ચકાર | 22 ઇતિ હેતોસ્તસ્ય
 સ વિશ્વાસસ્તદીયપુણ્યમિવ ગણયાઞ્ચકે | 23 પુણ્યમિવાગણ્યત તત્
 કેવલસ્ય તસ્ય નિમિત્તં લિખિતં નહિ, અસ્માકં નિમિત્તમપિ, 24 યતોડસ્માકં
 પાપનાશાર્થં સમર્પિતોડસ્માકં પુણ્યપ્રાપ્ત્યર્થઞ્ચોત્થાપિતોડભવત્ યોડસ્માકં
 પ્રભુ ર્થીશુસ્તસ્યોત્થાપયિતરીશ્વરે 25 યદિ વયં વિશ્વસામસ્તર્હસ્માકમપિ
 સએવ વિશ્વાસઃ પુણ્યમિવ ગણયિષ્યતે |

5 વિશ્વાસેન સપુણ્યીકૃતા વયમ્ ઇશ્વરેણ સાર્દ્ધં પ્રભુણાસ્માકં યીશુષ્ચીષ્ટેન
 મેલનં પ્રાપ્તાઃ | 2 અપરં વયં યસ્મિન્ અનુગ્રહાશ્રયે તિષ્ઠામસ્તન્મધ્યં
 વિશ્વાસમાર્ગેણ તેનૈવાનીતા વયમ્ ઇશ્વરીયવિભવપ્રાપ્તિપ્રત્યાશયા
 સમાનન્દામઃ | 3 તત્ કેવલં નહિ કિન્તુ ક્લેશભોગેડધ્યાનન્દામો યતઃ
 ક્લેશાદ્ ધૈર્યં જાયત ઇતિ વયં જાનીમઃ; 4 ધૈર્યાચ્ચ પરીક્ષિતત્વં જાયતે,
 પરીક્ષિતત્વાત્ પ્રત્યાશા જાયતે, 5 પ્રત્યાશાતો પ્રીડિતત્વં ન જાયતે, યસ્માદ્

અસ્મભ્યં દત્તેન પવિત્રેણાત્મનાસ્માકમ્ અન્તઃકરણાનીશ્વરસ્ય પ્રેમવારિણા
 સિક્તાનિ | 6 અસ્માસુ નિરુપાયેષુ સત્સુ ખ્રીષ્ટ ઉપયુક્તે સમયે પાપિનાં
 નિમિત્તં સ્વીયાન્ પ્રણાન્ અત્યજત્ | 7 હિતકારિણો જનસ્ય કૃતે કોપિ
 પ્રણાન્ ત્યક્તું સાહસં કર્તું શક્નોતિ, કિન્તુ ધાર્મિકસ્ય કૃતે પ્રાયેણ કોપિ
 પ્રણાન્ ન ત્યજતિ | 8 કિન્ત્વસ્માસુ પાપિષુ સત્સ્વપિ નિમિત્તમસ્માકં
 ખ્રીષ્ટઃ સ્વપ્રણાન્ ત્યક્તવાન્, તત ઈશ્વરોસ્માન્ પ્રતિ નિજં પરમપ્રેમાણં
 દર્શિતવાન્ | 9 અતએવ તસ્ય રક્તપાતેન સપુણ્યીકૃતા વયં નિતાન્તં તેન
 કોપાદ્ ઉદ્ધારિષ્યામહે | 10 ફલતો વયં યદા રિપવ આસ્મ તદેશ્વરસ્ય
 પુત્રસ્ય મરણેન તેન સાદ્ધ્વં યદસ્માકં મેલનં જાતં તર્હિ મેલનપ્રાપ્તાઃ
 સન્તોડવશ્યં તસ્ય જીવનેન રક્ષાં લખ્સ્યામહે | 11 તત્ કેવલં નહિ કિન્તુ
 યેન મેલનમ્ અલભામહિ તેનાસ્માકં પ્રભુણા યીશુખ્રીષ્ટેન સામ્પ્રતમ્ ઈશ્વરે
 સમાનન્દામશ્રય | 12 તથા સતિ, એકેન માનુષેણ પાપં પાપેન ય મરણં
 જગતીં પ્રાવિશત્ અપરં સર્વેષાં પાપિત્વાત્ સર્વે માનુષા મૃતે નિઘ્ના
 અભવત્ | 13 યતો વ્યવસ્થાદાનસમયં યાવત્ જગતિ પાપમ્ આસીત્
 કિન્તુ યત્ર વ્યવસ્થા ન વિદ્યતે તત્ર પાપસ્યાપિ ગણાના ન વિદ્યતે | 14
 તથાધ્યાદમા યાદૃશં પાપં કૃતં તાદૃશં પાપં યૈ નાર્કારિ આદમમ્ આરભ્ય
 મૂસાં યાવત્ તેષામધ્યુપરિ મૃત્યૂ રાજત્વમ્ અકરોત્ સ આદમ્ ભાવ્યાદમો
 નિદર્શનમેવાસ્તે | 15 કિન્તુ પાપકર્મણો યાદૃશો ભાવસ્તાદૃગ્ દાનકર્મણો
 ભાવો ન ભવતિ યત એકસ્ય જનસ્યાપરાધેન યદિ બહૂનાં મરણમ્ અઘટત
 તથાપીશ્વરાનુગ્રહસ્તદનુગ્રહમૂલકં દાનઞ્ચૈકેન જનેનાર્થાદ્ યીશુના ખ્રીષ્ટેન
 બહુષુ બાહુલ્યાતિબાહુલ્યેન ફલતિ | 16 અપરમ્ એકસ્ય જનસ્ય પાપકર્મ
 યાદૃક્ ફલયુક્તં દાનકર્મ તાદૃક્ ન ભવતિ યતો વિચારકર્મીકં પાપમ્ આરભ્ય
 દાડજનકં બભૂવ, કિન્તુ દાનકર્મ બહુપાપાન્યારભ્ય પુણ્યજનકં બભૂવ |
 17 યત એકસ્ય જનસ્ય પાપકર્મતસ્તેનૈકેન યદિ મરણસ્ય રાજત્વં જાતં
 તર્હિ યે જના અનુગ્રહસ્ય બાહુલ્યં પુણ્યદાનઞ્ચ પ્રાપ્નુવન્તિ ત એકેન જનેન,
 અર્થાત્ યીશુખ્રીષ્ટેન, જીવને રાજત્વમ્ અવશ્યં કરિષ્યન્તિ | 18 એકોડપરાધો
 યદ્વત્ સર્વમાનવાનાં દાડગામી માર્ગો ડભવત્ તદ્વદ્ એકં પુણ્યદાનં
 સર્વમાનવાનાં જીવનયુક્તપુણ્યગામી માર્ગ એવ | 19 અપરમ્ એકસ્ય
 જનસ્યાજ્ઞાલક્ષ્નાદ્ યથા બહવો ડપરાધિનો જાતાસ્તદ્વદ્ એકસ્યાજ્ઞાયરણાદ્

બહવઃ સપુણ્યીકૃતા ભવન્તિ | 20 અધિકન્તુ વ્યવસ્થાગમનાદ્ અપરાધસ્ય
 બાહુલ્યં જાતં કિન્તુ યત્ર પાપસ્ય બાહુલ્યં તત્રૈવ તસ્માદ્ અનુગ્રહસ્ય
 બાહુલ્યમ્ અભવત્ | 21 તેન મૃત્યુના યદ્વત્ પાપસ્ય રાજત્વમ્ અભવત્
 તદ્વદ્ અસ્માકં પ્રભુચીશુશ્રીષ્ટદ્વારાનન્તજીવનદાયિપુણ્યેનાનુગ્રહસ્ય રાજત્વં
 ભવતિ | (aiṅnios g166)

6 પ્રભૂતરૂપેણ યદ્ અનુગ્રહઃ પ્રકાશતે તદર્થં પાપે તિષ્ઠામ ઇતિ વાક્યં
 કિં વયં વદિષ્યામઃ? તન્ન ભવતુ | 2 પાપં પ્રતિ મૃતા વયં પુનસ્તસ્મિન્
 કથમ્ જીવિષ્યામઃ? 3 વયં યાવન્તો લોકા યીશુશ્રીષ્ટે મજ્જિજતા અભવામ
 તાવન્ત એવ તસ્ય મરણે મજ્જિજતા ઇતિ કિં યૂયં ન જાનીથ? 4 તતો
 યથા પિતુઃ પરાક્રમેણ શ્મશાનાત્ શ્રીષ્ટ ઉત્થાપિતસ્તથા વયમપિ યત્
 નૂતનજીવિન ઇવાચરામસ્તદર્થં મજ્જિજનેન તેન સાદ્ધ્ મૃત્યુરૂપે શ્મશાને
 સંસ્થાપિતાઃ | 5 અપરં વયં યદિ તેન સંયુક્તાઃ સન્તઃ સ ઇવ મરણભાગિનો
 જાતાસ્તદિ સ ઇવોત્થાનભાગિનોડપિ ભવિષ્યામઃ | 6 વયં યત્ પાપસ્ય
 દાસાઃ પુન ન ભવામસ્તદર્થમ્ અસ્માકં પાપરૂપશરીરસ્ય વિનાશાર્થમ્ અસ્માકં
 પુરાતનપુરુષસ્તેન સાકં કુશેડહન્યતેતિ વયં જાનીમઃ | 7 યો હતઃ સ પાપાત્
 મુક્ત એવ | 8 અતએવ યદિ વયં શ્રીષ્ટેન સાદ્ધ્મ્ અહન્યામહિ તદિ
 પુનરપિ તેન સહિતા જીવિષ્યામ ઇત્યત્રાસ્માકં વિશ્વાસો વિધતે | 9 યતઃ
 શ્મશાનાદ્ ઉત્થાપિતઃ શ્રીષ્ટો પુન ન મિચત ઇતિ વયં જાનીમઃ | તસ્મિન્
 કોપ્યધિકારો મૃત્યો નાસ્તિ | 10 અપરઞ્ચ સ યદ્ અમિચત તેનૈકદા પાપમ્
 ઉદિશ્યામિચત, યચ્ચ જીવતિ તેનેશ્વરમ્ ઉદિશ્ય જીવતિ; 11 તદ્વદ્ યૂયમપિ
 સ્વાન્ પાપમ્ ઉદિશ્ય મૃતાન્ અસ્માકં પ્રભુણા યીશુશ્રીષ્ટેનેશ્વરમ્ ઉદિશ્ય
 જીવન્તો જાનીત | 12 અપરઞ્ચ કુત્સિતાભિલાષાન્ પૂરયિતું યુષ્માકં મત્યદિહેષુ
 પાપમ્ આધિપત્યં ન કરોતુ | 13 અપરં સ્વં સ્વમ્ અજ્ઞમ્ અધર્મસ્યાસ્ત્રં
 કૃત્વા પાપસેવાયાં ન સમર્પયત, કિન્તુ શ્મશાનાદ્ ઉત્થિતાનિવ સ્વાન્ ઇશ્વરે
 સમર્પયત સ્વાન્યજ્ઞાનિ ચ ધર્માસ્ત્રસ્વરૂપાણીશ્વરમ્ ઉદિશ્ય સમર્પયત | 14
 યુષ્માકમ્ ઉપરિ પાપસ્યાધિપત્યં પુન ન ભવિષ્યતિ, યસ્માદ્ યૂયં વ્યવસ્થાયા
 અનાયત્તા અનુગ્રહસ્ય યાયત્તા અભવત | 15 કિન્તુ વયં વ્યવસ્થાયા
 અનાયત્તા અનુગ્રહસ્ય યાયત્તા અભવામ, ઇતિ કારણાત્ કિં પાપં કરિષ્યામઃ?
 તન્ન ભવતુ | 16 યતો મૃતિજનકં પાપં પુણ્યજનકં નિદેશાયરણઞ્ચૈતયોદ્વયો

યસ્મિન્ આજ્ઞાપાલનાર્થ ભૃત્યાનિવ સ્વાન્ સમર્પયથ, તસ્યૈવ ભૃત્યા ભવથ,
 એતત્ કિં યૂયં ન જાનીથ? 17 અપરઞ્ચ પૂર્વ યૂયં પાપસ્ય ભૃત્યા આસ્તેતિ
 સત્યં કિન્તુ યસ્યાં શિક્ષાઞ્ચપાયાં મૂષાયાં નિક્ષિપ્તા અભવત તસ્યા આકૃતિં
 મનોભિ લ્બ્ધવન્ત ઇતિ કારણાદ્ ઈશ્વરસ્ય ધન્યવાદો ભવતુ| 18 ઇત્યં યૂયં
 પાપસેવાતો મુક્તાઃ સન્તો ધર્મસ્ય ભૃત્યા જાતાઃ| 19 યુષ્માકં શારીરિક્યા
 દુર્બલતાયા હેતો મ્હાનવવદ્ અહમ્ એતદ્ બ્રવીમિ; પુનઃ પુનરધર્મકરણાર્થ
 યદ્વત્ પૂર્વ પાપામેધ્યયો ભૃત્યત્વે નિજાજ્ઞાનિ સમર્પયત તદ્વદ્ ઇદાનીં
 સાધુકર્મકરણાર્થ ધર્મસ્ય ભૃત્યત્વે નિજાજ્ઞાનિ સમર્પયત| 20 યદા યૂયં
 પાપસ્ય ભૃત્યા આસ્ત તદા ધર્મસ્ય નાયત્તા આસ્ત| 21 તર્હિ યાનિ
 કર્માણિ યૂયમ્ ઇદાનીં લજ્જાજનકાનિ બુધ્યધ્વે પૂર્વ તૈ યુષ્માકં કો લાભ
 આસીત્? તેષાં કર્માણાં ફલં મરણમેવ| 22 કિન્તુ સામ્પ્રતં યૂયં પાપસેવાતો
 મુક્તાઃ સન્ત ઈશ્વરસ્ય ભૃત્યાભવત તસ્માદ્ યુષ્માકં પવિત્રત્વરૂપં લભ્યમ્
 અનન્તજીવનરૂપઞ્ચ ફલમ્ આસ્તે| (aiṅnios g166) 23 યતઃ પાપસ્ય
 વેતનં મરણં કિન્ત્વસ્માકં પ્રભુણા યીશુપ્રીષ્ટેનાનન્તજીવનમ્ ઈશ્વરદત્તં
 પારિતોષિકમ્ આસ્તે| (aiṅnios g166)

7 હે ભ્રાતૃગણ વ્યવસ્થાવિદઃ પ્રતિ મમેદં નિવેદનં| વિધિઃ કેવલં યાવજ્જીવં
 માનવોપર્યધિપતિત્વં કરોતીતિ યૂયં કિં ન જાનીથ? 2 યાવત્કાલં પતિ
 જીવતિ તાવત્કાલમ્ ઊઢા ભાર્યા વ્યવસ્થયા તસ્મિન્ બદ્ધા તિષ્ઠતિ કિન્તુ
 યદિ પતિ મ્રિંચતે તર્હિ સા નારી પત્યુ વ્યવસ્થાતો મુચ્યતે| 3 એતત્કારણાત્
 પત્યુજીવનકાલે નારી યધન્યં પુરુષં વિવલતિ તર્હિ સા વ્યભિચારિણી
 ભવતિ કિન્તુ યદિ સ પતિ મ્રિંચતે તર્હિ સા તસ્યા વ્યવસ્થયા મુક્તા સતી
 પુરુષાન્તરેણ વ્યૂઢાપિ વ્યભિચારિણી ન ભવતિ| 4 હે મમ ભ્રાતૃગણ,
 ઈશ્વરનિમિત્તં યદસ્માકં ફલં જાયતે તદર્થ શ્મશાનાદ્ ઉત્યાપિતેન પુરુષેણ
 સહ યુષ્માકં વિવાહો યદ્ ભવેત્ તદર્થ પ્રીષ્ટસ્ય શરીરેણ યૂયં વ્યવસ્થાં
 પ્રતિ મૃતવન્તઃ| 5 યતોડસ્માકં શારીરિકાચરણસમયે મરણનિમિત્તં ફલમ્
 ઉત્પાદયિતું વ્યવસ્થયા દૂષિતઃ પાપાભિલાષોડસ્માકમ્ અજ્ઞેષુ જીવન્
 આસીત્| 6 કિન્તુ તદા યસ્યા વ્યવસ્થયા વશે આસ્મહિ સામ્પ્રતં તાં
 પ્રતિ મૃતવાદ્ વયં તસ્યા અધીનત્વાત્ મુક્તા ઇતિ હેતોરીશ્વરોડસ્માભિઃ
 પુરાતનલિખિતાનુસારાત્ ન સેવિતવ્યઃ કિન્તુ નવીનસ્વભાવેનૈવ સેવિતવ્યઃ

7 તર્હિ વયં કિં બ્રૂમઃ? વ્યવસ્થા કિં પાપજનિકા ભવતિ? નેત્યં ભવતુ |
વ્યવસ્થામ્ અવિધમાનાયાં પાપં કિમ્ ઇત્યહં નાવેદં; કિઞ્ચ લોભં મા
કાર્ષીરિતિ ચેદ્ વ્યવસ્થાગ્રન્થે લિખિતં નાભવિષ્યત્ તર્હિ લોભઃ કિમ્ભૂતસ્તદહં
નાજ્ઞાસ્યં | 8 કિન્તુ વ્યવસ્થયા પાપં છિદ્રં પ્રાપ્યાસ્માકમ્ અન્તઃ સર્વવિધં
કુત્સિતાભિલાષમ્ અજનયત્; યતો વ્યવસ્થાયામ્ અવિધમાનાયાં પાપં મૃતં |
9 અપરં પૂર્વં વ્યવસ્થાયામ્ અવિધમાનાયામ્ અહમ્ અજીવં તતઃ પરમ્
આજ્ઞાયામ્ ઉપસ્થિતાયામ્ પાપમ્ અજીવત્ તદાહમ્ અમ્રિયે | 10 ઇત્યં સતિ
જીવનનિમિત્તા યાજ્ઞા સા મમ મૃત્યુજનિકાભવત્ | 11 યતઃ પાપં છિદ્રં પ્રાપ્ય
વ્યવસ્થિતાદેશેન માં વઞ્ચયિત્વા તેન મામ્ અહન્ | 12 અતએવ વ્યવસ્થા
પવિત્રા, આદેશશ્ચ પવિત્રો ન્યાય્યો હિતકારી ચ ભવતિ | 13 તર્હિ યત્
સ્વયં હિતકૃત્ તત્ કિં મમ મૃત્યુજનકમ્ અભવત્? નેત્યં ભવતુ; કિન્તુ પાપં
યત્ પાતકમિવ પ્રકાશતે તથા નિદેશેન પાપં યદતીવ પાતકમિવ પ્રકાશતે
તદર્થં હિતોપાયેન મમ મરણમ્ અજનયત્ | 14 વ્યવસ્થાત્મબોધિકેતિ વયં
જાનીમઃ કિન્ત્વહં શારીરતાચારી પાપસ્ય કીતકિઙ્કરો વિધે | 15 યતો યત્
કર્મ કરોમિ તત્ મમ મનોહિમતં નહિ; અપરં યન્ મમ મનોહિમતં તન્ન
કરોમિ કિન્તુ યદ્ ઋતીયે તત્ કરોમિ | 16 તથાત્વે યન્ મમાનભિમતં તદ્
યદિ કરોમિ તર્હિ વ્યવસ્થા સૂત્રમેતિ સ્વીકરોમિ | 17 અતએવ સમ્પ્રતિ તત્
કર્મ મયા ક્રિયત ઇતિ નહિ કિન્તુ મમ શરીરસ્થેન પાપેનૈવ ક્રિયતે | 18
યતો મયિ, અર્થતો મમ શરીરે, કિમપ્યુત્તમં ન વસતિ, એતદ્ અહં જાનામિ;
મમેચ્છુકતાયાં તિષ્ઠન્ત્યામપ્યહમ્ ઉત્તમકર્મસાધને સમર્થો ન ભવામિ | 19
યતો યામુત્તમાં ક્રિયાં કર્તુમહં વાઞ્છામિ તાં ન કરોમિ કિન્તુ યત્ કુત્સિતં કર્મ
કર્તુમ્ અનિચ્છુકોહસ્મિ તદેવ કરોમિ | 20 અતએવ યદત્ કર્મ કર્તુ મમેચ્છા
ન ભવતિ તદ્ યદિ કરોમિ તર્હિ તત્ મયા ન ક્રિયતે, મમાન્તર્વર્તિના પાપેનૈવ
ક્રિયતે | 21 ભદ્રં કર્તુમ્ ઇચ્છુકં માં યો હભદ્રં કર્તુ પ્રવર્તયતિ તાદૃશં સ્વભાવમેકં
મયિ પશ્યામિ | 22 અહમ્ આન્તરિકપુરુષેણેશ્વરવ્યવસ્થાયાં સન્તુષ્ટ આસે;
23 કિન્તુ તદ્વિપરીતં યુધ્યન્તં તદન્યમેકં સ્વભાવં મદીયાઙ્ગસ્થિતં પ્રપશ્યામિ,
સ મદીયાઙ્ગસ્થિતપાપસ્વભાવસ્યાયત્તં માં કર્તુ યેષ્ટતે | 24 હા હા યોહહં
દુર્ભાગ્યો મનુજસ્તં મામ્ એતસ્માન્ મૃતાચ્છરીરાત્ કો નિસ્તારયિષ્યતિ?
25 અસ્માકં પ્રભુણા યીશુપ્રીષ્ટેન નિસ્તારયિતારમ્ ઇશ્વરં ધન્યં વદામિ |

अतश्चेव शरीरेण पापव्यवस्थाया मनसा तु ईश्वरव्यवस्थायाः सेवनं करोमि।

8 ये जनाः श्रीष्टं यीशुम् आश्रित्य शारीरिकं नायरन्त आत्मिकमायरन्ति तेऽधुना दण्डार्हा न भवन्ति। 2 ज्वनदयकस्यात्मनो व्यवस्था श्रीष्टयीशुना पापमरणयो र्व्यवस्थातो मामभोययत्। 3 यस्माच्छारीरस्य दुर्बलत्वाद् व्यवस्थया यत् कर्मासाध्यम् ईश्वरो निजपुत्रं पापिशरीररूपं पापनाशकबलिद्वयपत्र प्रेष्य तस्य शरीरे पापस्य दण्डं कुर्वन् तत्कर्म्म साधितवान्। 4 ततः शारीरिकं नायरित्वास्माभिरात्मिकम् आयरद्विर्यवस्थाग्रन्थे निर्दिष्टानि पुण्यकर्माणि सर्वाणि साध्यन्ते। 5 ये शारीरिकायारिणस्ते शारीरिकान् विषयान् भावयन्ति ये आत्मिकायारिणस्ते आत्मनो विषयान् भावयन्ति। 6 शारीरिकभावस्य इलं मृत्युः किञ्चात्मिकभावस्य इले ज्वनं शान्तिश्च। 7 यतः शारीरिकभाव ईश्वरस्य विरुद्धः शत्रुताभाव अेव स ईश्वरस्य व्यवस्थाया अधीनो न भवति भवितुञ्च न शक्नोति। 8 अेतस्मात् शारीरिकायारिषु तोष्टुम् ईश्वरेण न शक्यं। 9 किन्त्वीश्वरस्यात्मा यद्वि युष्माकं मध्ये वसति तर्हि यूयं शारीरिकायारिणो न सन्त आत्मिकायारिणो भवथः। यस्मिन् तु श्रीष्टस्यात्मा न विधते स तत्सम्भवो नहि। 10 यद्वि श्रीष्टो युष्मान् अधितिष्ठति तर्हि पापम् उद्दिश्य शरीरं मृतं किन्तु पुण्यमुद्दिश्यात्मा ज्वति। 11 मृतगणान् यीशु र्येनोत्थापितस्तस्यात्मा यद्वि युष्मन्मध्ये वसति तर्हि मृतगणात् श्रीष्टस्य स उत्थापयिता युष्मन्मध्यवासिना स्वकीयात्मना युष्माकं मृतदेहानपि पुनर्ज्वयिष्यति। 12 हे ब्रातृगण शरीरस्य वयमधमार्णा न भवामोऽतः शारीरिकायारोऽस्माभिर्न कर्तव्यः। 13 यद्वि यूयं शारीरिकायारिणो भवेत तर्हि युष्माभिर्भर्तव्यमेव किन्त्वात्मना यद्वि शरीरकर्माणि धातयेत तर्हि ज्विष्यथ। 14 यतो यावन्तो लोका ईश्वरस्यात्मनाकृष्यन्ते ते सर्व्व ईश्वरस्य सन्ताना भवन्ति। 15 यूयं पुनरपि भयजनकं दास्यभावं न प्राप्ताः किन्तु येन भावेनेश्वरं पितः पितरिति प्रोस्य सम्भोधयथ तादृशं दत्तकपुत्रत्वभावम् प्राप्नुत। 16 अपरञ्च वयम् ईश्वरस्य सन्ताना अेतस्मिन् पवित्र आत्मा स्वयम् अस्माकम् आत्माभिः सार्द्धं प्रमाणं ददाति। 17 अतश्चेव वयं यद्वि सन्तानास्तर्ह्यधिकारिणः,

અર્થાદ્ ઈશ્વરસ્ય સ્વત્વાધિકારિણઃ પ્રીયેન સહાધિકારિણશ્ચ ભવામઃ;
 અપરં તેન સાદ્ઘ્નં યદિ દુઃખભાગિનો ભવામસ્તર્હિ તસ્ય વિભવસ્યાપિ
 ભાગિનો ભવિષ્યામઃ | 18 કિન્ત્વસ્માસુ યો ભાવીવિભવઃ પ્રકાશિષ્યતે
 તસ્ય સમીપે વર્તમાનકાલીનં દુઃખમહં તૃણાય મન્યે | 19 યતઃ પ્રાણિગણ
 ઈશ્વરસ્ય સન્તાનાનાં વિભવપ્રાપ્તિમ્ આકાઙ્ક્ષન્ નિતાન્તમ્ અપેક્ષતે |
 20 અપરઞ્ચ પ્રાણિગણઃ સ્વૈરમ્ અલીકતાયા વશીકૃતો નાભવત્ 21
 કિન્તુ પ્રાણિગણોડપિ નશ્વરતાધીનત્વાત્ મુક્તઃ સન્ ઈશ્વરસ્ય સન્તાનાનાં
 પરમમુક્તિં પ્રાપ્સ્યતીત્યભિપ્રાયેણ વશીકર્ત્રા વશીયકે | 22 અપરઞ્ચ
 પ્રસૂયમાનાવદ્ વ્યથિતઃ સન્ ઇદાનીં યાવત્ કૃત્સ્નઃ પ્રાણિગણ આર્તસ્વરં
 કરોતીતિ વયં જાનીમઃ | 23 કેવલઃ સ ઇતિ નહિ કિન્તુ પ્રથમજાતફલસ્વરૂપમ્
 આત્માનં પ્રાપ્તા વયમપિ દત્તકપુત્રત્વપદપ્રાપ્તિમ્ અર્થાત્ શરીરસ્ય મુક્તિં
 પ્રતીક્ષમાણાસ્તદ્દદ્ અન્તરાર્તરાવં કુર્મઃ | 24 વયં પ્રત્યાશયા ત્રાણમ્
 અલભામહિ કિન્તુ પ્રત્યક્ષવસ્તુનો યા પ્રત્યાશા સા પ્રત્યાશા નહિ, યતો
 મનુષ્યો યત્ સમીક્ષતે તસ્ય પ્રત્યાશાં કુતઃ કરિષ્યતિ? 25 યદ્ અપ્રત્યક્ષં
 તસ્ય પ્રત્યાશાં યદિ વયં કુર્વીમહિ તર્હિ ધૈર્યમ્ અવલમ્બ્ય પ્રતીક્ષામહે |
 26 તત આત્માપિ સ્વયમ્ અસ્માકં દુર્બલતાયાઃ સહાયત્વં કરોતિ; યતઃ
 કિં પ્રાર્થિતવ્યં તદ્ બોદ્ધુ વયં ન શક્નુમઃ, કિન્ત્વસ્પષ્ટૈરાર્તરાવૈરાત્મા સ્વયમ્
 અસ્મન્નિમિત્તં નિવેદયતિ | 27 અપરમ્ ઈશ્વરાભિમતરૂપેણ પવિત્રલોકાનાં
 કૃતે નિવેદયતિ ય આત્મા તસ્યાભિપ્રાયોડન્તર્યામિના જ્ઞાયતે | 28 અપરમ્
 ઈશ્વરીયનિરૂપણાનુસારેણાહૂતાઃ સન્તો યે તસ્મિન્ પ્રીયન્તે સર્વાણિ
 મિલિત્વા તેષાં મજ્જલં સાધયન્તિ, એતદ્ વયં જાનીમઃ | 29 યત ઈશ્વરો
 બહુભ્રાતૃણાં મધ્યે સ્વપુત્રં જ્યેષ્ઠં કર્તુમ્ ઇચ્છન્ યાન્ પૂર્વ્વ લક્ષ્યીકૃતવાન્ તાન્
 તસ્ય પ્રતિમૂર્ત્યાઃ સાદૃશ્યપ્રાપ્ત્યર્થં ન્યયુંક્ત | 30 અપરઞ્ચ તેન યે નિયુક્તાસ્ત
 આહૂતા અપિ યે ય તેનાહૂતાસ્તે સપુણ્યીકૃતાઃ, યે ય તેન સપુણ્યીકૃતાસ્તે
 વિભવયુક્તાઃ | 31 ઇત્યત્ર વયં કિં બ્રૂમઃ? ઈશ્વરો યદ્ અસ્માકં સપક્ષો ભવતિ
 તર્હિ કો વિપક્ષોડસ્માકં? 32 આત્મપુત્રં ન રક્ષિત્વા યોડસ્માકં સર્વેષાં કૃતે તં
 પ્રદત્તવાન્ સ કિં તેન સહાસ્મભ્યમ્ અન્યાનિ સર્વાણિ ન દાસ્યતિ? 33
 ઈશ્વરસ્યાભિરુચિતેષુ કેન દોષ આરોપયિષ્યતે? ય ઈશ્વરસ્તાન્ પુણ્યવત
 ઇવ ગણયતિ કિં તેન? 34 અપરં તેભ્યો દણ્ડદાનાજ્ઞા વા કેન કરિષ્યતે?

યોડસ્મન્નિમિત્તં પ્રાણાન્ ત્યક્તવાન્ કેવલં તન્ન કિન્તુ મૃતગણમધ્યાદ્ ઉત્થિતવાન્, અપિ યેશ્વરસ્ય દક્ષિણે પાર્શ્વે તિષ્ઠન્ અધાપ્યસ્માકં નિમિત્તં પ્રાર્થત એવમ્ભૂતો યઃ પ્રીષ્ટઃ કિં તેન? 35 અસ્માભિઃ સહ પ્રીષ્ટસ્ય પ્રેમવિચ્છેદં જનયિતું કઃ શક્નોતિ? ક્લેશો વ્યસનં વા તાડના વા દુર્ભિક્ષં વા વસ્ત્રહીનત્વં વા પ્રાણસંશયો વા ખડ્ગો વા કિમેતાનિ શક્નુવન્તિ? 36 કિન્તુ લિખિતમ્ આસ્તે, યથા, વયં તવ નિમિત્તં સ્મો મૃત્યુવક્ત્રેડખિલં દિનં | બલિર્દેયો યથા મેષો વયં ગણ્યામહે તથા | 37 અપરં યોડસ્માસુ પ્રીયતે તેનૈતાસુ વિપત્સુ વયં સમ્યગ્ વિજ્યામહે | 38 યતોડસ્માકં પ્રભુના યીશુપ્રીષ્ટેનેશ્વરસ્ય યત્ પ્રેમ તસ્માદ્ અસ્માકં વિચ્છેદં જનયિતું મૃત્યુ જીવનં વા દિવ્યદૂતા વા બલવન્તો મુખ્યદૂતા વા વર્તમાનો વા ભવિષ્યન્ કાલો વા ઉચ્યપદં વા નીચપદં વાપરં કિમપિ સૃષ્ટવસ્તુ 39 વૈતેષાં કેનાપિ ન શક્યમિત્યસ્મિન્ દૃઢવિશ્વાસો મમાસ્તે |

9 અહં કાઞ્ચિદ્ કલ્પિતાં કથાં ન કથયામિ, પ્રીષ્ટસ્ય સાક્ષાત્ સત્યમેવ બ્રવીમિ પવિત્રસ્યાત્મનઃ સાક્ષાન્ મદીયં મન એતત્ સાક્ષ્યં દદાતિ | 2 મમાન્તરતિશયદુઃખં નિરન્તરં ખેદશ્ચ 3 તસ્માદ્ અહં સ્વજાતીયભ્રાતૃણાં નિમિત્તાત્ સ્વયં પ્રીષ્ટાચ્છાપાકાન્તો ભવિતુમ્ ઐચ્છમ્ | 4 યતસ્ત ઇસ્રાયેલસ્ય વંશા અપિ ચ દત્તકપુત્રત્વં તેજો નિયમો વ્યવસ્થાદાનં મન્દિરે ભજનં પ્રતિજ્ઞાઃ પિતૃપુરુષગણશ્ચૈતેષુ સર્વેષુ તેષામ્ અધિકારોડસ્તિ | 5 તત્ કેવલં નહિ કિન્તુ સર્વ્યાધ્યક્ષઃ સર્વદા સચ્ચિદાનન્દ ઇશ્વરો યઃ પ્રીષ્ટઃ સોડપિ શારીરિકસમ્બન્ધેન તેષાં વંશસમ્ભવઃ | (aiōn g165) 6 ઇશ્વરસ્ય વાક્યં વિફલં જાતમ્ ઇતિ નહિ ચત્કારણાદ્ ઇસ્રાયેલો વંશે યે જાતાસ્તે સર્વે વસ્તુત ઇસ્રાયેલીયા ન ભવન્તિ | 7 અપરમ્ ઇબ્રાહીમો વંશે જાતા અપિ સર્વે તસ્યૈવ સન્તાના ન ભવન્તિ કિન્તુ ઇસ્હાકો નામ્ના તવ વંશો વિખ્યાતો ભવિષ્યતિ | 8 અર્થાત્ શારીરિકસંસર્ગાત્ જાતાઃ સન્તાના યાવન્તસ્તાવન્ત એવેશ્વરસ્ય સન્તાના ન ભવન્તિ કિન્તુ પ્રતિશ્રવણાદ્ યે જાયન્તે તએવેશ્વરવંશો ગણ્યતે | 9 યતસ્તત્પ્રતિશ્રુતે વાક્યમેતત્, એતાદૃશે સમયે ડહં પુનરાગમિષ્યામિ તત્પૂર્વ્વં સારાયાઃ પુત્ર એકો જનિષ્યતે | 10 અપરમપિ વદામિ સ્વમનોડભિલાષત ઇશ્વરેણ યન્નિરૂપિતં તત્ કર્મ્મતો નહિ કિન્તવાહ્યચિતુ જાતમેતદ્ યથા સિદ્ધ્યતિ 11 તદર્થં રિબ્કાનામિકયા

યોષિતા જનૈકસ્માદ્ અર્થાદ્ અસ્માકમ્ ઇસ્હાકઃ પૂર્વપુરુષાદ્ ગર્ભે ધૃતે
 તસ્યાઃ સન્તાનયોઃ પ્રસવાત્ પૂર્વ્ય કિઞ્ચ તયોઃ શુભાશુભકર્મણઃ કરણાત્
 પૂર્વ્ય 12 તાં પ્રતીદં વાક્યમ્ ઉક્તં, જ્યેષ્ઠઃ કનિષ્ઠં સેવિષ્યતે, 13 યથા
 લિખિતમ્ આસ્તે, તથાપ્યેષાવિ ન પ્રીત્વા યાકૂભિ પ્રીતવાન્ અહં | 14 તર્હિ
 વયં કિં ભ્રૂમઃ? ઇશ્વરઃ કિમ્ અન્યાયકારી? તથા ન ભવતુ | 15 યતઃ સ સ્વયં
 મૂસામ્ અવદત્; અહં યસ્મિન્ અનુગ્રહં ચિકીર્ષામિ તમેવાનુગૃહ્ણામિ, યઞ્ચ
 દયિતુમ્ ઇચ્છામિ તમેવ દયે | 16 અતએવેચ્છતા યતમાનેન વા માનવેન તન્ન
 સાધ્યતે દયાકારિણેશ્વરેણૈવ સાધ્યતે | 17 ફિરૌણિ શાસ્ત્રે લિખતિ, અહં
 ત્વદ્વારા મત્પરાક્રમં દર્શયિતું સર્વ્યપૃથિવ્યાં નિજનામ પ્રકાશયિતુઞ્ચ ત્વાં
 સ્થાપિતવાન્ | 18 અતઃ સ યમ્ અનુગ્રહીતુમ્ ઇચ્છતિ તમેવાનુગૃહ્ણતિ,
 યઞ્ચ નિગ્રહીતુમ્ ઇચ્છતિ તં નિગૃહ્ણતિ | 19 યદિ વદસિ તર્હિ સ દોષં
 કુતો ગૃહ્ણતિ? તદીચેચ્છાયાઃ પ્રતિબન્ધકત્વં કર્ત્ત્વં કસ્ય સામર્થ્યં વિધતે?
 20 હે ઇશ્વરસ્ય પ્રતિપક્ષ મર્ત્ય ત્વં કઃ? એતાદૃશં માં કુતઃ સૃષ્ટવાન્?
 ઇતિ કથાં સૃષ્ટવસ્તુ સ્ત્રે કિં કથયિષ્યતિ? 21 એકસ્માન્ મૃત્પિણ્ડાદ્
 ઉત્કૃષ્ટાપકૃષ્ટૌ દ્વિવિધૌ કલશૌ કર્તુ કિં કુલાલસ્ય સામર્થ્યં નાસ્તિ? 22 ઇશ્વરઃ
 કોપં પ્રકાશયિતું નિજશક્તિં જ્ઞાપયિતુઞ્ચેચ્છન્ યદિ વિનાશસ્ય યોગ્યાનિ
 ક્રોધભાજનાનિ પ્રતિ બહુકાલં દીર્ઘસહિષ્ણુતામ્ આશ્રયતિ; 23 અપરઞ્ચ
 વિભવપ્રાપ્ત્યર્થં પૂર્વ્ય નિયુક્તાન્યનુગ્રહપાત્રાણિ પ્રતિ નિજવિભવસ્ય બાહુલ્યં
 પ્રકાશયિતું કેવલચિહ્નૈનાં નહિ ભિન્નદેશિનામપિ મધ્યાદ્ 24 અસ્માનિવ
 તાન્યાહ્યતિ તત્ર તવ કિં? 25 હોશેયગ્રન્થે યથા લિખિતમ્ આસ્તે, યો
 લોકો મમ નાસીત્ તં વદિષ્યામિ મદીયકં | યા જાતિ મેડપ્રિયા યાસીત્ તાં
 વદિષ્યામ્યહં પ્રિયાં | 26 યૂયં મદીયલોકા ન યત્રેતિ વાક્યમૌચ્યત | અમરેશસ્ય
 સન્તાના ઇતિ ખ્યાસ્યન્તિ તત્ર તે | 27 ઇસ્રાયેલીયલોકેષુ યિશાયિયોડપિ
 વાયમેતાં પ્રાચારયત્, ઇસ્રાયેલીયવંશાનાં યા સંખ્યા સા તુ નિશ્ચિતં |
 સમુદ્રસિકતાસંખ્યાસમાના યદિ જાયતે | તથાપિ કેવલં લોકૈરલ્પૈસ્ત્રાણં
 પ્રજિજ્યતે | 28 યતો ન્યાયેન સ્વં કર્મ પરેશઃ સાધયિષ્યતિ | દેશે સએવ
 સંક્ષેપાન્નિજં કર્મ કરિષ્યતિ | 29 યિશાયિયોડપરમપિ કથયામાસ,
 સૈન્યાધ્યક્ષપરેશેન ચેત્ કિઞ્ચિન્નોદશિષ્યત | તદા વયં સિદોમેવાભવિષ્યામ
 વિનિશ્ચિતં | યદ્વા વયમ્ અમોરાયા અગમિષ્યામ તુલ્યતાં | 30 તર્હિ વયં

કિં વક્ષ્યામઃ? ઇતરદેશીયા લોકા અપિ પુણ્યાર્થમ્ અયતમાના વિશ્વાસેન પુણ્યમ્ અલભન્ત; 31 કિન્ત્વિસ્રાયેલ્લોકા વ્યવસ્થાપાલનેન પુણ્યાર્થં યતમાનાસ્તન્ નાલભન્ત| 32 તસ્ય કિં કારણં? તે વિશ્વાસેન નહિ કિન્તુ વ્યવસ્થાયાઃ ક્રિયયા ચેષ્ટિત્વા તસ્મિન્ સ્ખલનજનકે પાષાણો પાદસ્ખલનં પ્રાપ્તાઃ| 33 લિખિતં યાદૃશમ્ આસ્તે, પશ્ય પાદસ્ખલાર્થં હિ સીયોનિ પ્રસ્તરન્તથા| બાધાકારઞ્ચ પાષાણં પરિસ્થાપિતવાનહમ્| વિશ્વસિષ્યતિ યસ્તત્ર સ જનો ન ત્રપિષ્યતે|

10 હે ભ્રાતર ઇસ્રાયેલીયલોકા યત્ પરિત્રાણં પ્રાપ્નુવન્તિ તદહં મનસાભિલષન્ ઇશ્વરસ્ય સમીપે પ્રાર્થયે| 2 યત ઇશ્વરે તેષાં ચેષ્ટા વિધત ઇત્યત્રાહં સાક્ષ્યસ્મિ; કિન્તુ તેષાં સા ચેષ્ટા સજ્ઞાના નહિ, 3 યતસ્ત ઇશ્વરદત્તં પુણ્યમ્ અવિજ્ઞાય સ્વકૃતપુણ્યં સ્થાપયિતુમ્ ચેષ્ટમાના ઇશ્વરદત્તસ્ય પુણ્યસ્ય નિઘ્નત્વં ન સ્વીકુર્વન્તિ| 4 ખ્રીષ્ટ એકૈકવિશ્વાસિજનાય પુણ્યં દાતું વ્યવસ્થાયાઃ ફલસ્વરૂપો ભવતિ| 5 વ્યવસ્થાપાલનેન યત્ પુણ્યં તત્ મૂસા વર્ણયામાસ, યથા, યો જનસ્તાં પાલયિષ્યતિ સ તદ્વારા જીવિષ્યતિ| 6 કિન્તુ પ્રત્યયેન યત્ પુણ્યં તદ્ એતાદૃશં વાક્યં વદતિ, કઃ સ્વર્ગમ્ આરુહ્ય ખ્રીષ્ટમ્ અવરોહયિષ્યતિ? 7 કો વા પ્રેતલોકમ્ અવરુહ્ય ખ્રીષ્ટં મૃતગણમધ્યાદ્ આનેષ્યતીતિ વાક્ય મનસિ ત્વયા ન ગદિતવ્યા| (Abyssos g12) 8 તર્હિ કિં બ્રવીતિ? તદ્ વાક્યં તવ સમીપસ્થમ્ અર્થાત્ તવ વદને મનસિ યાસ્તે, તચ્ચ વાક્યમ્ અસ્માભિઃ પ્રચાર્યમાણં વિશ્વાસસ્ય વાક્યમેવ| 9 વસ્તુતઃ પ્રભુ યીશુ યદિ વદનેન સ્વીકરોષિ, તથેશ્વરસ્તં શ્મશાનાદ્ ઉદ્દસ્થાપયદ્ ઇતિ યદન્તઃકરણેન વિશ્વસિષિ તર્હિ પરિત્રાણં લપ્સ્યસે| 10 યસ્માત્ પુણ્યપ્રાપ્ત્યર્થમ્ અન્તઃકરણેન વિશ્વસિતવ્યં પરિત્રાણાર્થઞ્ચ વદનેન સ્વીકર્તવ્યં| 11 શાસ્ત્રે યાદૃશં લિખતિ વિશ્વસિષ્યતિ યસ્તત્ર સ જનો ન ત્રપિષ્યતે| 12 ઇત્યત્ર ચિહ્નુદિનિ તદન્યલોકે ચ કોપિ વિશેષો નાસ્તિ યસ્માદ્ યઃ સર્વેષામ્ અદ્વિતીયઃ પ્રભુઃ સ નિજયાયકાન સર્વાન્ પ્રતિ વદાન્યો ભવતિ| 13 યતઃ, યઃ કશ્ચિત્ પરમેશસ્ય નામ્ના હિ પ્રાર્થયિષ્યતે| સ એવ મનુજો નૂનં પરિત્રાતો ભવિષ્યતિ| 14 યં ચે જના ન પ્રત્યાયન્ તે તમુદ્દિશ્ય કથં પ્રાર્થયિષ્યન્તે? ચે વા યસ્યાખ્યાનં કદાપિ ન શ્રુતવન્તસ્તે તં કથં પ્રત્યેષ્યન્તિ? અપરં યદિ પ્રચારયિતારો ન તિષ્ઠન્તિ તદા કથં તે શ્રોષ્યન્તિ?

15 યદિ વા પ્રેરિતા ન ભવન્તિ તદા કથં પ્રચારયિષ્યન્તિ? યાદૃશં લિખિતમ્
આસ્તે, યથા, માઙ્ગલિકં સુસંવાદં દદત્યાનીય યે નરાઃ | પ્રચારયન્તિ શાન્તેશ્ચ
સુસંવાદં જનાસ્તુ યે | તેષાં ચરણપદ્માનિ કીદૃક્ શોભાન્વિતાનિ હિ | 16
કિન્તુ તે સર્વે તં સુસંવાદં ન ગૃહીતવન્તઃ | યિશાયિયો યથા લિખિતવાન્ |
અસ્મત્પ્રચારિતે વાક્યે વિશ્વાસમકરોદ્ધિ કઃ | 17 અતએવ શ્રવણાદ્
વિશ્વાસ ઐશ્વરવાક્યપ્રચારાત્ શ્રવણાઞ્ચ ભવતિ | 18 તર્હાં બ્રવીમિ તૈઃ કિં
નાશ્રાવિ? અવશ્યમ્ અશ્રાવિ, યસ્માત્ તેષાં શબ્દો મહીં વ્યાખ્નોદ્ વાક્યઞ્ચ
નિખિલં જગત્ | 19 અપરમપિ વદામિ, ઇસ્રાયેલીયલોકાઃ કિમ્ એતાં
કથાં ન બુદ્ધ્યન્તે? પ્રથમતો મૂસા ઇદં વાક્યં પ્રોવાચ, અહમુત્તાપયિષ્યે તાન્
અગણ્યમાનવૈરપિ | કલેક્ષ્યામિ જાતિમ્ એતાઞ્ચ પ્રોન્મત્તભિન્નજાતિભિઃ |
20 અપરઞ્ચ યિશાયિયોડતિશયાક્ષોભેણ કથયામાસ, યથા, અધિ માં ચૈસ્તુ
નાયેષ્ટિ સમ્પ્રાપ્તસ્તૈ જનૈરહં | અધિ માં ચૈ ન સમ્પૃષ્ટં વિજ્ઞાતસ્તૈ જનૈરહં | |
21 કિન્ત્વિસ્રાયેલીયલોકાન્ અધિ કથયાઞ્ચકાર, ચૈરાજ્ઞાલક્ષિભિ લોકૈર્વિરુદ્ધં
વાક્યમુચ્યતે | તાન્ પ્રત્યેવ દિનં કૃત્સ્નં હસ્તૌ વિસ્તારયામ્યહં | |

11 ઇશ્વરેણ સ્વીકીયલોકા અપસારિતા અહં કિમ્ ઇદૃશં વાક્યં
બ્રવીમિ? તન્ન ભવતુ યતોડહમપિ બિન્યામીનગોત્રીય ઇબ્રાહીમવંશીય
ઇસ્રાયેલીયલોકોડસ્મિ | 2 ઇશ્વરેણ પૂર્વે યે પ્રદૃષ્ટાસ્તે સ્વીકીયલોકા
અપસારિતા ઇતિ નહિ | અપરમ્ એલિયોપાખ્યાને શાસ્ત્રે યલ્લિખિતમ્
આસ્તે તદ્ યૂયં કિં ન જાનીથ? 3 હે પરમેશ્વર લોકાસ્ત્વદીયાઃ સર્વા
યજ્ઞવેદીરભઞ્જન્ તથા તવ ભવિષ્યદ્વાદિનઃ સર્વાન્ અઘ્નન્ કેવલ એકોડહમ્
અવશિષ્ટ આસે તે મમાપિ પ્રાણાન્ નાશયિતું યેષ્ટનતે, એતાં કથામ્
ઇસ્રાયેલીયલોકાનાં વિરુદ્ધમ્ એલિય ઇશ્વરાય નિવેદયામાસ | 4 તતસ્તં
પ્રતીશ્વરસ્યોત્તરં કિં જાતં? બાલ્નામ્નો દેવસ્ય સાક્ષાત્ ચૈર્જનૂનિ ન પાતિતાનિ
તાદૃશાઃ સપ્ત સહસ્રાણિ લોકા અવશેષિતા મયા | 5 તદ્દદ્ એતસ્મિન્
વર્તમાનકાલેડપિ અનુગ્રહેણાભિરુચિતાસ્તેષામ્ અવશિષ્ટાઃ કતિપયા લોકાઃ
સન્તિ | 6 અતએવ તદ્ યદનુગ્રહેણ ભવતિ તર્હિ ક્રિયયા ન ભવતિ નો ચેદ્
અનુગ્રહોડનનુગ્રહ એવ, યદિ વા ક્રિયયા ભવતિ તર્હાનુગ્રહેણ ન ભવતિ નો
ચેત્ ક્રિયા ક્રિયૈવ ન ભવતિ | 7 તર્હિ કિં? ઇસ્રાયેલીયલોકા યદ્ અમૃગયન્ત
તન્ન પ્રાપુઃ | કિન્ત્વભિરુચિતલોકાસ્તત્ પ્રાપુસ્તદન્યે સર્વ અન્ધીભૂતાઃ |

8 યથા લિખિતમ્ આસ્તે, ઘોરનિદ્રાલુતાભાવં દૃષ્ટિહીને ચ લોચને | કર્ણો
શ્રુતિવિહીનો ચ પ્રદદૌ તેભ્ય ઈશ્વરઃ | | 9 એતેસ્મિન્ દાયુદ્ધપિ લિખિતવાન્
યથા, અતો ભુક્ત્યાસનં તેષામ્ ઉન્માથવદ્ ભવિષ્યતિ | વા વંશયન્ત્રવદ્
બાધા દણ્ડવદ્ વા ભવિષ્યતિ | | 10 ભવિષ્યન્તિ તથાન્ધાસ્તે નેત્રૈઃ પશ્યન્તિ
નો યથા | વેપથુઃ કટિદેશસ્ય તેષાં નિત્યં ભવિષ્યતિ | | 11 પતનાર્થં તે
સ્ખલિતવન્ત ઇતિ વાયં કિમહં વદામિ? તન્ન ભવતુ કિન્તુ તાન્ ઉદ્યોગિનઃ
કર્તુ તેષાં પતનાદ્ ઇતરદેશીયલોકેઃ પરિત્રાણં પ્રાપ્તં | 12 તેષાં પતનં યદિ
જગતો લોકાનાં લાભજનકમ્ અભવત્ તેષાં હાસોડપિ યદિ ભિન્નદેશિનાં
લાભજનકોડભવત્ તર્હિ તેષાં વૃદ્ધિઃ કતિ લાભજનિકા ભવિષ્યતિ? 13
અતો હે અન્યદેશિનો યુષ્માન્ સમ્બોધ્ય કથયામિ નિજાનાં જ્ઞાતિબન્ધૂનાં
મનઃસૂદ્યોગં જનયન્ તેષાં મધ્યે કિયતાં લોકાનાં યથા પરિત્રાણં સાધયામિ
14 તન્નિમિત્તમ્ અન્યદેશિનાં નિકટે પ્રેરિતઃ સન્ અહં સ્વપદસ્ય મહિમાનં
પ્રકાશયામિ | 15 તેષાં નિગ્રહેણ યદીશ્વરેણ સહ જગતો જનાનાં મેલનં
જાતં તર્હિ તેષામ્ અનુગૃહીતત્વં મૃતદેહે યથા જીવનલાભસ્તદ્વત્ કિં ન
ભવિષ્યતિ? 16 અપરં પ્રથમજાતં ફલં યદિ પવિત્રં ભવતિ તર્હિ સર્વમેવ ફલં
પવિત્રં ભવિષ્યતિ; તથા મૂલં યદિ પવિત્રં ભવતિ તર્હિ શાખા અપિ તથૈવ
ભવિષ્યન્તિ | 17 કિયતીનાં શાખાનાં છેદને કૃતે ત્વં વન્યજિતવૃક્ષસ્ય શાખા
ભૂત્વા યદિ તચ્છાખાનાં સ્થાને રોપિતા સતિ જિતવૃક્ષીયમૂલસ્ય રસં ભુંક્ષે,
18 તર્હિ તાસાં ભિન્નશાખાનાં વિરુદ્ધં માં ગર્વીઃ; યદિ ગર્વીસિ તર્હિ ત્વં મૂલં
યન્ન ધારયસિ કિન્તુ મૂલં ત્વાં ધારયતીતિ સંસ્મર | 19 અપરઞ્ચ યદિ વદસિ
માં રોપયિતું તાઃ શાખા વિભન્ના અભવન્; 20 ભદ્રમ્ અપ્રત્યયકારણાત્ તે
વિભિન્ના જાતાસ્તથા વિશ્વાસકારણાત્ ત્વં રોપિતો જાતસ્તસ્માદ્ અહઙ્કારમ્
અકૃત્વા સસાધ્વસો ભવ | 21 યત ઈશ્વરો યદિ સ્વાભાવિકીઃ શાખા ન
રક્ષતિ તર્હિ સાવધાનો ભવ ચેત્ ત્વામપિ ન સ્થાપયતિ | 22 ઇત્યન્નેશ્વરસ્ય
યાદૃશી કૃપા તાદૃશં ભયાનકત્વમપિ ત્વયા દૃશ્યતાં; યે પતિતાસ્તાન્ પ્રતિ
તસ્ય ભયાનકત્વં દૃશ્યતાં, ત્વઞ્ચ યદિ તત્કૃપાશ્રિતસ્તિષ્ઠસિ તર્હિ ત્વાં પ્રતિ
કૃપા દ્રક્ષ્યતે; નો ચેત્ ત્વમપિ તદ્વત્ ઇન્નો ભવિષ્યસિ | 23 અપરઞ્ચ તે
યદપ્રત્યયે ન તિષ્ઠન્તિ તર્હિ પુનરપિ રોપયિષ્યન્તે યસ્માત્ તાન્ પુનરપિ
રોપયિતુમ્ ઈશ્વરસ્ય શક્તિરાસ્તે | 24 વન્યજિતવૃક્ષસ્ય શાખા સન્ ત્વં

યદિ તતશ્ચિન્નો શીતિવ્યત્યયેનોત્તમજિતવૃક્ષે રોપિતોડભવસ્તર્હિ તસ્ય
 વૃક્ષસ્ય સ્વીયા યાઃ શાખાસ્તાઃ કિં પુનઃ સ્વવૃક્ષે સંલગિતું ન શક્નુવન્તિ? 25
 હે ભ્રાતરો યુષ્માકમ્ આત્માભિમાનો યન્ન જાયતે તદર્થં મમેદૃશી વાગ્છા
 ભવતિ યૂયં એતન્નિગૂઢતત્ત્વમ્ અજાનન્તો યન્ન તિષ્ઠથઃ; વસ્તુતો યાવત્કાલં
 સમ્પૂર્ણરૂપેણ ભિન્નદેશિનાં સંગ્રહો ન ભવિષ્યતિ તાવત્કાલમ્ અંશત્વેન
 ઇસ્રાયેલીયલોકાનામ્ અન્ધતા સ્થાસ્યતિ; 26 પશ્ચાત્ તે સર્વે પરિત્રાસ્યન્તે;
 એતાદૃશં લિખિતમધ્યાસ્તે, આગમિષ્યતિ સીયોનાદ્ એકો યસ્ત્રાણદાયકઃ |
 અધર્મં યાકુબો વંશાત્ સ તુ દૂરીકરિષ્યતિ | 27 તથા દૂરીકરિષ્યામિ તેષાં
 પાપાન્યહં યદા | તદા તૈરેવ સાર્દ્ધં મે નિયમોડયં ભવિષ્યતિ | 28 સુસંવાદાત્
 તે યુષ્માકં વિપક્ષા અભવન્ કિન્ત્વભિરુચિતત્વાત્ તે પિતૃલોકાનાં કૃતે
 પ્રિયપાત્રાણિ ભવન્તિ | 29 યત ઇશ્વરસ્ય દાનાદ્ આહ્વાનાઞ્ચ પશ્ચાત્તાપો ન
 ભવતિ | 30 અતએવ પૂર્વમ્ ઇશ્વરેડવિશ્વાસિનઃ સન્તોડપિ યૂયં યદ્વત્
 સમ્પ્રતિ તેષામ્ અવિશ્વાસકારણાદ્ ઇશ્વરસ્ય કૃપાપાત્રાણિ જાતાસ્તદ્દદ્ 31
 ઇદાનીં તેડવિશ્વાસિનઃ સન્તિ કિન્તુ યુષ્માભિ લ્બ્ધકૃપાકારણાત્ તૈરપિ કૃપા
 લપ્સ્યતે | 32 ઇશ્વરઃ સર્વાન્ પ્રતિ કૃપાં પ્રકાશયિતું સર્વાન્ અવિશ્વાસિત્વેન
 ગણાયતિ | (eleēsē g1653) 33 અહો ઇશ્વરસ્ય જ્ઞાનબુદ્ધિરૂપયો ધનયોઃ
 કીદૃક્ પ્રાયુર્થ્યં | તસ્ય રાજશાસનસ્ય તત્ત્વં કીદૃગ્ અપ્રાપ્યં | તસ્ય માર્ગાશ્ચ
 કીદૃગ્ અનુપલક્ષ્યાઃ | 34 પરમેશ્વરસ્ય સક્રુલ્પં કો જ્ઞાતવાન્? તસ્ય મન્ત્રી
 વા કોડભવત્? 35 કો વા તસ્યોપકારી ભૃત્વા તત્કૃતે તેન પ્રત્યુપકર્ત્તવ્યઃ?
 36 યતો વસ્તુમાત્રમેવ તસ્માત્ તેન તસ્મૈ યાભવત્ તદીયો મહિમા સર્વ્વદા
 પ્રકાશિતો ભવતુ | ઇતિ | (aiōn g165)

12 હે ભ્રાતર ઇશ્વરસ્ય કૃપયાહં યુષ્માન્ વિનયે યૂયં સ્વં સ્વં શરીરં સજીવં
 પવિત્રં ગ્રાહ્યં ભલિમ્ ઇશ્વરમુદ્દિશ્ય સમુત્સૃજત, એષા સેવા યુષ્માકં યોગ્યા |
 2 અપરં યૂયં સાંસારિકા ઇવ માયરત, કિન્તુ સ્વં સ્વં સ્વભાવં પરાવર્ત્ય
 નૂતનાચારિણો ભવત, તત ઇશ્વરસ્ય નિદેશઃ કીદૃગ્ ઉત્તમો ગ્રહણીયઃ
 સમ્પૂર્ણશ્રોતિ યુષ્માભિરનુભાવિષ્યતે | (aiōn g165) 3 કશ્ચિદપિ જનો
 યોગ્યત્વાદધિકં સ્વં ન મન્યતાં કિન્તુ ઇશ્વરો યસ્મૈ પ્રત્યયસ્ય યત્પરિમાણમ્
 અદદાત્ સ તદનુસારતો યોગ્યરૂપં સ્વં મનુતામ્, ઇશ્વરાદ્ અનુગ્રહં પ્રાપ્તઃ સન્
 યુષ્માકમ્ એકૈકં જનમ્ ઇત્યાજ્ઞાપયામિ | 4 યતો યદ્વદસ્માકમ્ એકસ્મિન્

शरीरे बहुन्यङ्गानि सन्ति किन्तु सर्वेषामङ्गानां कार्यं समानं नहि; 5
तद्वदस्माकं बहुत्वेऽपि सर्वे वयं श्रीष्टे अेकशरीराः परस्परम् अङ्गप्रत्यङ्गत्वेन
भवामः। 6 अस्माद् ईश्वरानुग्रहेण विशेषं विशेषं दानम् अस्मासु प्राप्तेषु
सत्सु कोपि यदि भविष्यद्वाक्यं वदति तर्हि प्रत्ययस्य परिमाणानुसारतः स
तद् वदतु; 7 यद्वा यदि कश्चित् सेवनकारी भवति तर्हि स तत्सेवनं करोतु;
अथवा यदि कश्चिद् अध्यापयिता भवति तर्हि सोऽध्यापयतु; 8 तथा य
उपदेष्टा भवति स उपदिशतु यश्च दाता स सरलतया ददातु यस्त्वधिपतिः
स यत्नेनाधिपतित्वं करोतु यश्च दयालुः स हृष्टमनसा दयताम्। 9 अपरञ्च
युष्माकं प्रेम कापट्यवर्जितं भवतु यद् अमर्द्रं तद् ऋतीयध्वं यय्य मर्द्रं
तस्मिन् अनुरज्यध्वम्। 10 अपरं भ्रातृत्वप्रेम्ना परस्परं प्रीयध्वं समादराद्
अेकोऽपरञ्चनं श्रेष्ठं ज्ञानीध्वम्। 11 तथा कार्ये निरालस्या मनसि य
सोद्योगाः सन्तः प्रभुं सेवध्वम्। 12 अपरं प्रत्याशायाम् आनन्दिता
द्भुसमये य धैर्ययुक्ता भवतः; प्रार्थनायां सततं प्रवर्तध्वं। 13 पवित्राणां
दीनतां दूरीकुरुध्वम् अतिथिसेवायाम् अनुरज्यध्वम्। 14 ये जना युष्मान्
ताऽयन्ति तान् आशिषं वदत शापम् अदत्त्वा ददध्वमाशिषम्। 15 ये जना
आनन्दन्ति तैः सार्द्धम् आनन्दत ये य रुदन्ति तैः सऽ रुदित। 16 अपरञ्च
युष्माकं मनसां परस्परम् अेकोभावो भवतु; अपरम् उच्यपदम् अनाकाङ्क्ष्य
नीयलोकैः सऽपि मार्दवम् आचरतः; स्वान् ज्ञानिनो न मन्यध्वं। 17
परस्माद् अपकारं प्राच्यापि परं नापकुरुत। सर्वेषां दृष्टितो यत् कर्मोत्तमं
तदेव कुरुत। 18 यदि भवितुं शक्यते तर्हि यथाशक्ति सर्वलोकैः सऽ
निर्व्विरोधेन कालं यापयत। 19 हे प्रियबन्धवः, कस्मैचिद् अपकारस्य
समुचितं दण्डं स्वयं न ददध्वं, किन्तु ईश्वरीयकोषाय स्थानं दत्त यतो
लिपितमास्ते परमेश्वरः कथयति, दानं कुलस्य मन्कर्म्म सूचितं प्रददाभ्यहं।
20 एतिकांशान् शिषु र्यदि क्षुधार्तस्ते तर्हि तं त्वं प्रभोजय। तथा यदि तृषार्तः
स्यात् तर्हि तं परिचायय। तेन त्वं मस्तके तस्य ज्वलदग्निं निधास्यसि।
21 कुड्कियथा पराजिता न सन्त उत्तमकुड्कियथा कुड्कियां पराजयत।

13 युष्माकम् अेकैकञ्चनः शासनपदस्य निध्नो भवतु यतो यानि
शासनपदानि सन्ति तानि सर्वाणीश्वरेण स्थापितानि; ईश्वरं विना
पदस्थापनं न भवति। 2 एति हेतोः शासनपदस्य यत् प्रातिकूल्यं तद्

ઈશ્વરીયનિરૂપણસ્ય પ્રાતિકૂલ્યમેવ; અપરં યે પ્રાતિકૂલ્યમ્ આચરન્તિ તે સ્વેષાં સમુચિતં દણ્ડં સ્વયમેવ ઘટયન્તે | 3 શાસ્તા સદાચારિણાં ભયપ્રદો નહિ દુરાચારિણામેવ ભયપ્રદો ભવતિ; ત્વં કિં તસ્માન્ નિર્ભયો ભવિતુમ્ ઇચ્છસિ? તર્હિ સત્કર્માચર, તસ્માદ્ યશો લપ્સ્યસે, 4 યતસ્તવ સદાચરણાય સ ઈશ્વરસ્ય ભૃત્યોડસ્તિ | કિન્તુ યદિ કુકર્માચરસિ તર્હિ ત્વં શકુસ્વ યતઃ સ નિરર્થકં ખજ્જં ન ધારયતિ; કુકર્માચારિણં સમુચિતં દણ્ડયિતુમ્ સ ઈશ્વરસ્ય દણ્ડભૃત્ય એવ | 5 અતએવ કેવલદણ્ડભયાન્નહિ કિન્તુ સદસદ્બોધાદપિ તસ્ય વશ્યેન ભવિતવ્યં | 6 એતસ્માદ્ યુષ્માકં રાજકરદાનમપ્યુચિતં યસ્માદ્ યે કરં ગૃહ્ણન્તિ ત ઈશ્વરસ્ય કિકુરા ભૂત્વા સતતમ્ એતસ્મિન્ કર્મણિ નિવિષ્ટાસ્તિષ્ણન્તિ | 7 અસ્માત્ કરગ્રાહિણે કરં દત્ત, તથા શુલ્કગ્રાહિણે શુલ્કં દત્ત, અપરં યસ્માદ્ ભેતવ્યં તસ્માદ્ બિભીત, યશ્ચ સમાદરણીયસ્તં સમાદ્રિયધ્વમ્; ઇત્યં યસ્ય યત્ પ્રાપ્યં તત્ તસ્મૈ દત્ત | 8 યુષ્માકં પરસ્પરં પ્રેમ વિના ડન્યત્ કિમપિ દેયમ્ ઋણં ન ભવતુ, યતો યઃ પરસ્મિન્ પ્રેમ કરોતિ તેન વ્યવસ્થા સિધ્યતિ | 9 વસ્તુતઃ પરદારાન્ મા ગચ્છ, નરહત્યાં મા કાર્ષીઃ, ચૈર્યં મા કાર્ષીઃ, મિથ્યાસાક્ષ્યં મા દેહિ, લોભં મા કાર્ષીઃ, એતાઃ સર્વા આજ્ઞા એતાભ્યો ભિન્ના યા કાયિદ્ આજ્ઞાસ્તિ સાપિ સ્વસમીપવાસિનિ સ્વવત્ પ્રેમ કુર્વિત્યનેન વચનેન વેદિતા | 10 યતઃ પ્રેમ સમીપવાસિનોડશુભં ન જનયતિ તસ્માત્ પ્રેમ્ના સર્વા વ્યવસ્થા પાલ્યતે | 11 પ્રત્યયીભવનકાલેડસ્માકં પરિત્રાણસ્ય સામીપ્યાદ્ ઇદાનીં તસ્ય સામીપ્યમ્ અવ્યવહિતં; અતઃ સમયં વિવિચ્યાસ્માભિઃ સામ્પ્રતમ્ અવશ્યમેવ નિદ્રાતો જાગર્તવ્યં | 12 બહુતરા યામિની ગતા પ્રભાતં સન્નિધિં પ્રાપ્તં તસ્માત્ તામસીયાઃ ક્રિયાઃ પરિત્યજ્યાસ્માભિ વાસરીયા સજ્જા પરિઘાતવ્યા | 13 અતો હેતો વયં દિવા વિહિતં સદાચરણમ્ આચરિષ્યામઃ | રજ્જરસો મત્તત્વં લમ્પટત્વં કામુકત્વં વિવાદ ઈર્ષ્યા ચૈતાનિ પરિત્યક્ષ્યામઃ | 14 યૂયં પ્રભુયીશુપ્રીષ્ટરૂપં પરિચ્છદં પરિઘદ્ધ્વં સુખાભિલાષપૂરણાય શારીરિકાચરણં માચરત |

14 યો જનોડદૃઢવિશ્વાસસ્તં યુષ્માકં સર્જિનં કુરુત કિન્તુ સન્દેહવિચારાર્થં નહિ | 2 યતો નિષિદ્ધં કિમપિ ખાધદ્રવ્યં નાસ્તિ, કસ્યચિજ્જનસ્ય પ્રત્યય એતાદૃશો વિધતે કિન્ત્વદૃઢવિશ્વાસઃ કશ્ચિદપરો જનઃ કેવલં શાકં ભુક્તં |

૩ તર્હિ યો જનઃ સાધારણં દ્રવ્યં ભુક્તે સ વિશેષદ્રવ્યભોક્તારં નાવજાનીયાત્
 તથા વિશેષદ્રવ્યભોક્તાપિ સાધારણદ્રવ્યભોક્તારં દોષિણં ન કુર્યાત્, યસ્માદ્
 ઈશ્વરસ્તમ્ અગૃહ્ણાત્ | ૪ હે પરદાસસ્ય દૂષયિતસ્ત્વં કઃ? નિજપ્રભોઃ સમીપે
 તેન પદસ્થેન પદચ્યુતેન વા ભવિતવ્યં સ ય પદસ્થ એવ ભવિષ્યતિ યત
 ઈશ્વરસ્તં પદસ્થં કર્તુ શક્નોતિ | ૫ અપરઞ્ચ કશ્ચિજ્જનો દિનાદ્ દિનં
 વિશેષં મન્યતે કશ્ચિત્તુ સર્વાણિ દિનાનિ સમાનાનિ મન્યતે, એકૈકો જનઃ
 સ્વીયમનસિ વિવિચ્ય નિશ્ચિનોતુ | ૬ યો જનઃ કિઞ્ચન દિનં વિશેષં મન્યતે સ
 પ્રભુભક્ત્યા તન્ મન્યતે, યશ્ચ જનઃ કિમપિ દિનં વિશેષં ન મન્યતે સોઽપિ
 પ્રભુભક્ત્યા તન્ મન્યતે; અપરઞ્ચ યઃ સર્વાણિ ભક્ષ્યદ્રવ્યાણિ ભુક્તે સ
 પ્રભુભક્તયા તાનિ ભુક્તે યતઃ સ ઈશ્વરં ધન્યં વક્તિ, યશ્ચ ન ભુક્તે
 સોઽપિ પ્રભુભક્ત્યૈવ ન ભુજ્ઞાન ઈશ્વરં ધન્યં બ્રૂતે | ૭ અપરમ્ અસ્માકં
 કશ્ચિત્ નિજનિમિત્તં પ્રાણાન્ ધારયતિ નિજનિમિત્તં મ્રિયતે વા તન્ન; ૮ કિન્તુ
 યદિ વયં પ્રાણાન્ ધારયામસ્તર્હિ પ્રભુનિમિત્તં ધારયામઃ, યદિ ય પ્રાણાન્
 ત્યજામસ્તર્હાપિ પ્રભુનિમિત્તં ત્યજામઃ, અતએવ જીવને મરણે વા વયં
 પ્રભોરેવાસ્મહે | ૯ યતો જીવન્તો મૃતાશ્ચેત્યુભયેષાં લોકાનાં પ્રભુત્વપ્રાપ્ત્યર્થં
 ખ્રીષ્ઠો મૃત ઉત્થિતઃ પુનર્જીવિતશ્ચ | ૧૦ કિન્તુ ત્વં નિજં ભ્રાતરં કુતો દૂષયસિ?
 તથા ત્વં નિજં ભ્રાતરં કુતસ્તુચ્છં જાનાસિ? ખ્રીષ્ઠસ્ય વિચારસિંહાસનસ્ય
 સમ્મુખે સર્વૈરસ્માભિરુપસ્થાતવ્યં; ૧૧ યાદૃશં લિખિતમ્ આસ્તે, પરેશઃ
 શપથં કુર્વન્ વાક્યમેતત્ પુરાવદત્ | સર્વો જનઃ સમીપે મે જાનુપાતં
 કરિષ્યતિ | જિહ્વૈકૈકા તથેશસ્ય નિઘ્નત્વં સ્વીકરિષ્યતિ | ૧૨ અતએવ
 ઈશ્વરસમીપેઽસ્માકમ્ એકૈકજનેન નિજા કથા કથયિતવ્યા | ૧૩ ઇત્યં
 સતિ વયમ્ અધારભ્ય પરસ્પરં ન દૂષયન્તઃ સ્વભ્રાતુ વિઘ્નો વ્યાઘાતો વા
 યન્ન જાયેત તાદૃશીમીહાં કુર્મહે | ૧૪ કિમપિ વસ્તુ સ્વભાવતો નાશુચિ
 ભવતીત્યહં જાને તથા પ્રભુના યીશુખ્રીષ્ઠેનાપિ નિશ્ચિતં જાને, કિન્તુ યો જનો
 યદ્ દ્રવ્યમ્ અપવિત્રં જાનીતે તસ્ય કૃતે તદ્ અપવિત્રમ્ આસ્તે | ૧૫ અતએવ
 તવ ભક્ષ્યદ્રવ્યેણ તવ ભ્રાતા શોકાન્વિતો ભવતિ તર્હિ ત્વં ભ્રાતરં પ્રતિ પ્રેમ્ના
 નાયરસિ | ખ્રીષ્ઠો યસ્ય કૃતે સ્વપ્રાણાન્ વ્યયિતવાન્ ત્વં નિજેન ભક્ષ્યદ્રવ્યેણ
 તં ન નાશય | ૧૬ અપરં યુષ્માકમ્ ઉત્તમં કર્મ નિન્દિતં ન ભવતુ | ૧૭ ભક્ષ્યં
 પેયઞ્ચેશ્વરરાજ્યસ્ય સારો નહિ, કિન્તુ પુણ્યં શાન્તિશ્ચ પવિત્રેણાત્મના

જાત આનન્દશ્ચ | 18 એતૈ યો જનઃ પ્રીષ્ટં સેવતે, સ એવેશ્વરસ્ય તુષ્ટિકરો
 મનુષ્યૈશ્ચ સુખ્યાતઃ | 19 અતએવ યેનાસ્માકં સર્વેષાં પરસ્પરમ્ ઐક્યં નિષ્ઠા
 ય જાયતે તદેવાસ્માભિ ર્યતિતવ્યં | 20 ભક્ષ્યાર્થમ્ ઈશ્વરસ્ય કર્મણો હાનિ
 મા જનયતઃ; સર્વ વસ્તુ પવિત્રમિતિ સત્યં તથાપિ યો જનો યદ્ ભુક્ત્વા
 વિઘ્નં લભતે તદર્થં તદ્ ભદ્રં નહિ | 21 તવ માંસભક્ષણસુરાપાનાદિભિઃ
 ક્રિયાભિ ર્યદિ તવ ભ્રાતુઃ પાદસ્ખલનં વિઘ્નો વા યાઞ્ચલ્યં વા જાયતે તર્હિ
 તદ્ગોજનપાનયોસ્ત્યાગો ભદ્રઃ | 22 યદિ તવ પ્રત્યયસ્તિષ્ઠતિ તર્હિશ્વરસ્ય
 ગોચરે સ્વાન્તરે તં ગોપય; યો જનઃ સ્વમતેન સ્વં દોષિણં ન કરોતિ સ એવ
 ધન્યઃ | 23 કિન્તુ યઃ કશ્ચિત્ સંશય્ય ભુક્તેડર્થાત્ ન પ્રતીત્ય ભુક્તે, સ
 એવાવશ્યં દાડાર્હો ભવિષ્યતિ, યતો યત્ પ્રત્યયજં નહિ તદેવ પાપમયં
 ભવતિ |

15 બલવદ્ધિરસ્માભિ દુર્બલનાં દૌર્બલ્યં સોઢ્યં ન ય સ્વેષામ્ ઈષ્ટાચાર
 આચરિતવ્યઃ | 2 અસ્માકમ્ એકૈકો જનઃ સ્વસમીપવાસિનો હિતાર્થં નિષ્ઠાર્થઞ્ચ
 તસ્ચૈવેષ્ટાચારમ્ આચરતુ | 3 યતઃ પ્રીષ્ટોડપિ નિજેષ્ટાચારં નાચરિતવાન્,
 યથા લિખિતમ્ આસ્તે, ત્વન્નિન્દકગણસ્યૈવ નિન્દાભિ નિન્દિતોડસ્મ્યહં | 4
 અપરઞ્ચ વયં યત્ સહિષ્ણુતાસાન્ત્વનયો જનકેન શાસ્ત્રેણ પ્રત્યાશાં લભેમહિ
 તન્નિમિત્તં પૂર્વકાલે લિખિતાનિ સર્વવચનાન્યસ્માકમ્ ઉપદેશાર્થમેવ
 લિલિખિરે | 5 સહિષ્ણુતાસાન્ત્વનયોરાકરો ય ઈશ્વરઃ સ એવં કરોતુ યત્ પ્રભુ
 ર્યોશુપ્રીષ્ટ ઇવ યુષ્માકમ્ એકજનોડન્યજનેન સાદ્ધ્ મનસ ઐક્યમ્ આચરેત્; 6
 યૂયઞ્ચ સર્વ એકચિત્તા ભૂત્વા મુખેકેનેવાસ્મત્પ્રભુચીશુપ્રીષ્ટસ્ય પિતુરીશ્વરસ્ય
 ગુણાન્ કીર્તયેત | 7 અપરમ્ ઈશ્વરસ્ય મહિમ્નઃ પ્રકાશાર્થં પ્રીષ્ટો યથા
 યુષ્માન્ પ્રત્યગૃહ્ણાત્ તથા યુષ્માકમપ્યેકો જનોડન્યજનં પ્રતિગૃહ્ણાતુ | 8 યથા
 લિખિતમ્ આસ્તે, અતોડહં સમ્મુખે તિષ્ઠન્ ભિન્નદેશનિવાસિનાં | સ્તુવંસ્ત્વાં
 પરિગાસ્યામિ તવ નામ્નિ પરેશ્વર | | 9 તસ્ય દયાલુત્વાચ્ય ભિન્નજાતીયા
 યદ્ ઈશ્વરસ્ય ગુણાન્ કીર્તયેયુસ્તદર્થં ચીશુઃ પ્રીષ્ટસ્ત્વકષ્ટેદનિયમસ્ય
 નિઘ્નોડભવદ્ ઇત્યહં વદામિ | યથા લિખિતમ્ આસ્તે, અતોડહં સમ્મુખે
 તિષ્ઠન્ ભિન્નદેશનિવાસિનાં | સ્તુવંસ્ત્વાં પરિગાસ્યામિ તવ નામ્નિ પરેશ્વર | |
 10 અપરમપિ લિખિતમ્ આસ્તે, હે અન્યજાતયો યૂયં સમં નન્દત તજ્જનૈઃ | 11
 પુનશ્ચ લિખિતમ્ આસ્તે, હે સર્વદેશિનો યૂયં ધન્યં ભૂત પરેશ્વરં | હે તદીયનરા

यूयं कुरुध्वं तत्प्रशंसनं | 12 अपर यीशायियोऽपि विलेप, यीशयस्य तु
 यत् मूलं तत् प्रकाशिष्यते तदा | सर्वज्जातीयनृणाञ्च शासकः समुद्देश्यति |
 तत्रान्यदेशिलोकैश्च प्रत्याशा प्रकरिष्यते | 13 अतमेव यूयं पवित्रस्यात्मनः
 प्रभावाद् यत् सम्पूर्णां प्रत्याशां लप्स्यध्वे तदर्थं तत्प्रत्याशाजनक ईश्वरः
 प्रत्ययेन युष्मान् शान्त्यानन्दाभ्यां सम्पूर्णान् करोतु | 14 हे भ्रातरो
 यूयं सद्भावयुक्ताः सर्वप्रकारेण ज्ञानेन य सम्पूर्णाः परस्पररोपदेशे य
 तत्परा इत्यहं निश्चितं जानामि, 15 तथाप्यहं यत् प्रगल्भतरो भवन्
 युष्मान् प्रबोधयामि तस्यैकं कारणमिदं | 16 भिन्नजातीयाः पवित्रेणात्मना
 पावितनैवेधयुक्ता भूत्वा यद् ग्राह्या भवेयुस्तन्निमित्तमहम् ईश्वरस्य सुसंवाहं
 प्रयारयितुं भिन्नजातीयानां मध्ये यीशुःप्रीत्यस्य सेवकत्वं दानं ईश्वरात्
 लब्धवानस्मि | 17 ईश्वरं प्रति यीशुःप्रीत्येन मम श्लाघाकरणस्य कारणम्
 आस्ते | 18 भिन्देशिन आज्ञाग्राहिणः कर्तुं प्रीत्ये वाक्येन क्रियया य,
 आश्चर्यलक्षणाश्चिन्त्रक्रियाभिः पवित्रस्यात्मनः प्रभावेन य यानि कर्माणि
 मया साधितवान्, 19 केवलं तान्येव विनान्यस्य कस्यचित् कर्माणो वार्णानां
 कर्तुं प्रगल्भो न भवामि | तस्मात् आ यिज्ञशलम इल्लूरिकं यावत्
 सर्वत्र प्रीत्यस्य सुसंवाहं प्रायारयं | 20 अन्येन नियितायां भित्तावहं
 यन्न नियिनोमि तन्निमित्तं यत्र यत्र स्थाने प्रीत्यस्य नाम कदापि केनापि न
 ज्ञापितं तत्र तत्र सुसंवाहं प्रयारयितुम् अहं यते | 21 यादृशं लिपितम्
 आस्ते, यै वार्ता तस्य न प्राप्ता दर्शनं तैस्तु लप्स्यते | यैश्च नैव श्रुतं
 किञ्चित् बोद्धुं शक्यन्ति ते जनाः | 22 तस्माद् युष्मत्समीपगमनाद्
 अहं मुहुर्मुहुर्निवारितोऽभवम् | 23 किन्त्विदानीम् अत्र प्रदेशेषु मया न
 गतं स्थानं किमपि नावशिष्यते युष्मत्समीपं गन्तुं बहुवत्सरानारभ्य
 मामकीनाकाङ्क्षा य विधत् इति हेतोः 24 स्थानियादेशगमनकालेऽहं
 युष्मन्मध्ये गच्छन् युष्मान् आलोकिष्ये, ततः परं युष्मत्सम्भाषणेन तृप्तिं
 परिलभ्य तद्देशगमनार्थं युष्माभिर्विसर्जयिष्ये, ईदृशी मदीया प्रत्याशा
 विधते | 25 किन्तु साम्प्रतं पवित्रलोकानां सेवनाय यिज्ञशलमनगरं प्रजामि |
 26 यतो यिज्ञशलमस्थपवित्रलोकानां मध्ये ये दरिद्रा अर्थविश्राणनेन
 तानुपकर्तुं माकिदनियादेशीया आभायादेशीयाश्च लोका अयच्छन् | 27 अेषा
 तेषां सदृष्ट्या यतस्ते तेषाम् ऋणिनः सन्ति यतो हेतोर्भिन्नजातीया

येषां परमार्थस्यांशिनो जाता औडिकविषये तेषामुपकारस्तैः कर्तव्यः | 28
 अतो मया तत् कर्म साधयित्वा तस्मिन् इले तेभ्यः समर्पिते युष्मन्मध्येन
 स्यान्नियादेशो गमिष्यते | 29 युष्मत्समीपे ममागमनसमये श्रीष्टस्य
 सुसंवाद्यस्य पूर्णवरेण सम्बलितः सन् अहम् आगमिष्यामि इति मया
 ज्ञायते | 30 हे भ्रातृगण प्रबो र्यीशुश्रीष्टस्य नाम्ना पवित्रस्यात्मानः
 प्रेम्ना य विनयेऽहं 31 यिद्धादेशस्थानाम् अविश्वासिलोकानां करेभ्यो
 यदहं रक्षं लभेय मदीयैतेन सेवनकर्माणा य यद् यिज्ञाशलमस्थाः
 पवित्रलोकास्तुष्येयुः, 32 तदर्थं यूयं मत्कृत ईश्वराय प्रार्थयमाणा यतध्वं
 तेनाहम् ईश्वरेच्छया सानन्दं युष्मत्समीपं गत्वा युष्माभिः सङ्घितः प्राणान्
 आप्यायितुं पारयिष्यामि | 33 शान्तिदायक ईश्वरो युष्माकं सर्वेषां सङ्गी
 भूयात् | इति |

16 किङ्कीयानगरीयधर्मसमाजस्य परियारिका या द्वैवीनामिकास्माकं
 धर्मभगिनी तस्याः कृतेऽहं युष्मान् निवेदयामि, 2 यूयं तां प्रभुमाश्रितां
 विज्ञाय तस्या आतिथ्यं पवित्रलोकार्हां कुरुध्वं, युष्मत्तस्तस्या य उपकारो
 भवितुं शक्नोति तं कुरुध्वं, यस्मात् तथा बहूनां मम योपकारः कृतः | 3
 अपरञ्च श्रीष्टस्य यीशोः कर्माणि मम सङ्कारिणौ मम प्राणरक्षार्थञ्च
 स्वप्राणान् पणीकृतवन्तौ यौ प्रिष्ठिल्लाङ्किलौ तौ मम नमस्कारं ज्ञापयध्वं |
 4 ताभ्याम् उपकारान्तिः केवलं मया स्वीकर्तव्येति नहि त्मिन्नेश्वरीयैः
 सर्वधर्मसमाजैरपि | 5 अपरञ्च तयोर्गृहे स्थितान् धर्मसमाजलोकान् मम
 नमस्कारं ज्ञापयध्वं | तद्वत् आशियादेशे श्रीष्टस्य पक्षे प्रथमजातङ्गलस्वपुत्रो
 य एपेनितनामा मम प्रियबन्धुस्तमपि मम नमस्कारं ज्ञापयध्वं | 6 अपरं
 बहुश्रमेणास्मान् असेवत या मरियम् तामपि नमस्कारं ज्ञापयध्वं | 7
 अपरञ्च प्रेरितेषु ज्यातकीर्ती मद्ये श्रीष्टाश्रितौ मम स्वजातीयौ सङ्बन्दिनौ
 य यावान्द्रनीकयूनियौ तौ मम नमस्कारं ज्ञापयध्वं | 8 तथा प्रबो मत्प्रियतमम्
 आम्बिलयमपि मम नमस्कारं ज्ञापयध्वं | 9 अपरं श्रीष्टसेवायां मम
 सङ्कारिणाम् उर्बाणां मम प्रियतमं स्ताभुञ्च मम नमस्कारं ज्ञापयध्वं |
 10 अपरं श्रीष्टेन परीक्षितम् आपिल्लिं मम नमस्कारं वदत, आरिष्टबूलस्य
 परिजनांश्च मम नमस्कारं ज्ञापयध्वं | 11 अपरं मम ज्ञातिं डेरोदियोनं मम
 नमस्कारं वदत, तथा नार्किसस्य परिवाराणां मध्ये ये प्रभुमाश्रितास्तान् मम

નમસ્કારં વદત | 12 અપરં પ્રભોઃ સેવાયાં પરિશ્રમકારિણ્યૌ ત્રુફ્નેનાત્રુફ્નોષે મમ
 નમસ્કારં વદત, તથા પ્રભોઃ સેવાયામ્ અત્યન્તં પરિશ્રમકારિણી યા પ્રિયા
 પરિસ્તાં નમસ્કારં જ્ઞાપયધ્વં | 13 અપરં પ્રભોરભિરુચિતં રૂફં મમ ધર્મમાતા
 યા તસ્ય માતા તામપિ નમસ્કારં વદત | 14 અપરમ્ અસુંકૃતં ફિલગોનં
 હર્મ્ પાત્રભં હર્મિમ્ એતેષાં સક્ષિબ્રાતૃગણાઞ્ચ નમસ્કારં જ્ઞાપયધ્વં |
 15 અપરં ફિલલગો યૂલિયા નીરિયસ્તસ્ય ભગિન્યલુમ્પા ચૈતાન્ એતૈઃ
 સાદ્ધૃં યાવન્તઃ પવિત્રલોકા આસતે તાનપિ નમસ્કારં જ્ઞાપયધ્વં | 16 યૂયં
 પરસ્પરં પવિત્રયુખ્મનેન નમસ્કુરુધ્વં | ખ્રીષ્ટસ્ય ધર્મસમાજગણો યુષ્માન્
 નમસ્કુરુતે | 17 હે બ્રાતરો યુષ્માન્ વિનયેડહં યુષ્માભિ ર્યા શિક્ષા લબ્ધા તામ્
 અતિક્રમ્ય યે વિચ્છેદાન્ વિઘ્નાંશ્ચ કુર્વન્તિ તાન્ નિશ્ચિનુત તેષાં સક્ષં વર્જયત
 ચ | 18 યતસ્તાદૃશા લોકા અસ્માકં પ્રભો ર્યાશુખ્રીષ્ટસ્ય દાસા ઇતિ નહિ
 કિન્તુ સ્વોદરસ્યૈવ દાસાઃ; અપરં પ્રણયવચનૈર્મધુરવાક્યૈશ્ચ સરલલોકાનાં
 મનાંસિ મોહયન્તિ | 19 યુષ્માકમ્ આજ્ઞાગ્રાહિત્વં સર્વત્ર સર્વે જ્ઞાતં
 તતોડહં યુષ્માસુ સાનન્દોડભવં તથાપિ યૂયં યત્ સત્જ્ઞાનેન જ્ઞાનિનઃ કુજ્ઞાને
 યાતત્પરા ભવેતેતિ મમાભિલાષઃ | 20 અધિકન્તુ શાન્તિદાયક ઇશ્વરઃ
 શૈતાનમ્ અવિલમ્બં યુષ્માકં પદાનામ્ અધો મર્દિષ્યતિ | અસ્માકં પ્રભુ
 ર્યાશુખ્રીષ્ટો યુષ્માસુ પ્રસાદં ક્રિયાત્ | ઇતિ | 21 મમ સહકારી તીમથિયો મમ
 જ્ઞાતયો લૂકિયો યાસોન્ સોસિપાત્રશ્રમે યુષ્માન્ નમસ્કુર્વન્તે | 22 અપરમ્
 એતત્પત્રલેખકસ્તર્તિયનામાહમપિ પ્રભો નામિના યુષ્માન્ નમસ્કરોમિ | 23
 તથા કૃત્સ્નધર્મસમાજસ્ય મમ યાતિથ્યકારી ગાયો યુષ્માન્ નમસ્કરોતિ |
 અપરમ્ એતન્નગરસ્ય ધનરક્ષક ઇરાસ્તઃ ક્કાર્તનામકશ્ચૈકો બ્રાતા તાવપિ
 યુષ્માન્ નમસ્કુરુતઃ | 24 અસ્માકં પ્રભુ ર્યાશુખ્રીષ્ટા યુષ્માસુ સર્વેષુ પ્રસાદં
 ક્રિયાત્ | ઇતિ | 25 પૂર્વકાલિકયુગેષુ પ્રચ્છન્ના યા મન્ત્રણાધુના પ્રકાશિતા
 ભૂત્વા ભવિષ્યદ્વાદિલિખિતગ્રન્થગણસ્ય પ્રમાણાદ્ વિશ્વાસેન ગ્રહણાર્થ
 સદાતનસ્યેશ્વરસ્યાજ્ઞયા સર્વદેશીયલોકાન્ જ્ઞાપ્યતે, (aiōnios g166) 26
 તસ્યા મન્ત્રણાયા જ્ઞાનં લબ્ધ્વા મયા યઃ સુસંવાદો યીશુખ્રીષ્ટમધિ પ્રચાર્યતે,
 તદનુસારાદ્ યુષ્માન્ ધર્મો સુસ્થિરાન્ કર્તુ સમર્થો યોડદ્વિતીયઃ (aiōnios g166)
 27 સર્વજ્ઞ ઇશ્વરસ્તસ્ય ધન્યવાદો યીશુખ્રીષ્ટેન સન્તતં ભૂયાત્ | ઇતિ |
 (aiōn g165)

૧ કરિન્ધિન:

1 યાવન્ત: પવિત્રા લોકાઃ સ્વેષામ્ અસ્માકઞ્ચ વસતિસ્થાનેષ્વસ્માકં પ્રભો ર્થીશોઃ ખ્રીષ્ટસ્ય નામ્ના પ્રાર્થયન્તે તેઃ સહાહૂતાનાં ખ્રીષ્ટેન યીશુના પવિત્રીકૃતાનાં લોકાનાં ચ ઇશ્વરીયઘર્મસમાજઃ કરિન્ધનગરે વિધતે 2 તં પ્રતીશ્વરસ્યેચ્છયાહૂતો યીશુખ્રીષ્ટસ્ય પ્રેરિતઃ પૌલઃ સોસ્થિનિનામા ભ્રાતા ચ પત્રં લિખતિ | 3 અસ્માકં પિત્રેશ્વરેણ પ્રભુના યીશુખ્રીષ્ટેન ચ પ્રસાદઃ શાન્તિશ્ચ યુષ્મભ્યં દીયતાં | 4 ઇશ્વરો યીશુખ્રીષ્ટેન યુષ્માન્ પ્રતિ પ્રસાદં પ્રકાશિતવાન્, તસ્માદહં યુષ્મન્નિમિત્તં સર્વ્વદા મદીયેશ્વરં ધન્યં વદામિ | 5 ખ્રીષ્ટસમ્બન્ધીયં સાક્ષ્યં યુષ્માકં મધ્યે યેન પ્રકારેણ સપ્રમાણમ્ અભવત્ 6 તેન યૂયં ખ્રીષ્ટાત્ સર્વ્વવિધવક્તૃતાજ્ઞાનાદીનિ સર્વ્વધનાનિ લબ્ધવન્તઃ | 7 તતોડસ્મત્પ્રભો ર્થીશુખ્રીષ્ટસ્ય પુનરાગમનં પ્રતીક્ષમાણાનાં યુષ્માકં કસ્યાપિ વરસ્યાભાવો ન ભવતિ | 8 અપરમ્ અસ્માકં પ્રભો ર્થીશુખ્રીષ્ટસ્ય દિવસે યૂયં યન્નિર્દોષા ભવેત તદર્થં સએવ યાવદન્તં યુષ્માન્ સુસ્થિરાન્ કરિષ્યતિ | 9 ય ઇશ્વરઃ સ્વપુત્રસ્યાસ્મત્પ્રભો ર્થીશુખ્રીષ્ટસ્યાંશિનઃ કર્તુ યુષ્માન્ આહૂતવાન્ સ વિશ્વસનીયઃ | 10 હે ભ્રાતરઃ, અસ્માકં પ્રભુયીશુખ્રીષ્ટસ્ય નામ્ના યુષ્માન્ વિનયેડહં સર્વ્વે યુષ્માભિરેકરૂપાણિ વાક્યાનિ કથ્યન્તાં યુષ્મન્મધ્યે ભિન્નસહ્જાતા ન ભવન્તુ મનોવિચારયોરૈક્યેન યુષ્માકં સિદ્ધત્વં ભવતુ | 11 હે મમ ભ્રાતરો યુષ્મન્મધ્યે વિવાદા જાતા ઇતિ વાર્તામિહં કલોચ્યાઃ પરિજને જ્ઞાપિતઃ | 12 મમાભિપ્રેતમિદં યુષ્માકં કશ્ચિત્ કશ્ચિદ્ વદતિ પૌલસ્ય શિષ્યોડહમ્ આપલ્લોઃ શિષ્યોડહં કૈફાઃ શિષ્યોડહં ખ્રીષ્ટસ્ય શિષ્યોડહમિતિ ચ | 13 ખ્રીષ્ટસ્ય કિં વિભેદઃ કૃતઃ? પૌલઃ કિં યુષ્મત્કૃતે કુશે હતઃ? પૌલસ્ય નામ્ના વા યૂયં કિં મજ્જિજતાઃ? 14 ક્રિષ્પગાયૌ વિના યુષ્માકં મધ્યેડન્યઃ કોડપિ મયા ન મજ્જિજત ઇતિ હેતોરહમ્ ઇશ્વરં ધન્યં વદામિ | 15 એતેન મમ નામ્ના માનવા મયા મજ્જિજતા ઇતિ વક્તું કેનાપિ ન શક્યતે | 16 અપરં સ્તિફાનસ્ય પરિજના મયા મજ્જિજતાસ્તદન્યઃ કશ્ચિદ્ યન્મયા મજ્જિજતસ્તદહં ન વેદ્મિ | 17 ખ્રીષ્ટેનાહં મજ્જિજનાર્થં ન પ્રેરિતઃ કિન્તુ સુસંવાદસ્ય પ્રચારાર્થમેવ; સોડપિ વાક્યપટ્ટતયા મયા ન પ્રચારિતવ્યઃ, યતસ્તથા પ્રચારિતે ખ્રીષ્ટસ્ય કુશે મૃત્યુઃ ફલહીનો ભવિષ્યતિ | 18 યતો હેતો ર્થે વિનશ્યન્તિ તે તાં કુશસ્ય વાર્તા પ્રલાપમિવ મન્યન્તે કિન્તુ પરિત્રાણં લભમાનેષ્વસ્માસુ સા

ઈશ્વરીયશક્તિસ્વરૂપા | 19 તસ્માદિત્યં લિખિતમાસ્તે, જ્ઞાનવતાન્તુ યત્
જ્ઞાનં તન્મયા નાશયિષ્યતે | વિલોપયિષ્યતે તદ્વદ્ બુદ્ધિર્બદ્ધિમતાં મયા | | 20
જ્ઞાની કુત્ર? શાસ્ત્રી વા કુત્ર? ઇલ્લોકસ્ય વિચારતત્પરો વા કુત્ર? ઇલ્લોકસ્ય
જ્ઞાનં કિમીશ્વરેણ મોહીકૃતં નહિ? (āṅg g165) 21 ઈશ્વરસ્ય જ્ઞાનાદ્
ઇલ્લોકસ્ય માનવાઃ સ્વજ્ઞાનેનેશ્વરસ્ય તત્ત્વબોધં ન પ્રાપ્તવન્તસ્તસ્માદ્
ઈશ્વરઃ પ્રચારરૂપિણા પ્રલાપેન વિશ્વાસિનઃ પરિત્રાતું રોચિતવાન્ | 22
ચિહ્નૈયલોકા લક્ષણાનિ દિદૃક્ષન્તિ ભિન્નદેશીયલોકાસ્તુ વિદ્યાં મૃગયન્તે,
23 વયઞ્ચ કુશે હતં ખ્રીષ્ટં પ્રચારયામઃ | તસ્ય પ્રચારો ચિહ્નૈયૈર્વિઘ્ન ઇવ
ભિન્નદેશીયૈશ્ચ પ્રલાપ ઇવ મન્યતે, 24 કિન્તુ ચિહ્નૈયાનાં ભિન્નદેશીયાનાઞ્ચ
મધ્યે યે આહૂતાસ્તેષુ સ ખ્રીષ્ટ ઈશ્વરીયશક્તિરિશ્વરીયજ્ઞાનમિવ ય
પ્રકાશતે | 25 યત ઈશ્વરે યઃ પ્રલાપ આરોપ્યતે સ માનવાતિરિક્તં જ્ઞાનમેવ
યચ્ચ દૌર્બલ્યમ્ ઈશ્વર આરોપ્યતે તત્ માનવાતિરિક્તં બલમેવ | 26 હે
બ્રાતરઃ, આહૂતયુષ્મદ્ગણો યષ્માભિરાલોક્યતાં તન્મધ્યે સાંસારિકજ્ઞાનેન
જ્ઞાનવન્તઃ પરાક્રમિણો વા કુલીના વા બહવો ન વિધન્તે | 27 યત ઈશ્વરો
જ્ઞાનવતસ્ત્રપયિતું મૂર્ખલોકાન્ રોચિતવાન્ બલાનિ ય ત્રપયિતુમ્ ઈશ્વરો
દુર્બલોન્ રોચિતવાન્ | 28 તથા વર્તમાનલોકાન્ સંસ્થિતિભ્રષ્ટાન્ કર્તુમ્
ઈશ્વરો જગતોડપકૃષ્ટાન્ હેયાન્ અવર્તમાનાંશ્ચાભિરોચિતવાન્ | 29 તત
ઈશ્વરસ્ય સાક્ષાત્ કેનાપ્યાત્મશલાઘા ન કર્તવ્યા | 30 યૂયઞ્ચ તસ્માત્ ખ્રીષ્ટે
યીશૌ સંસ્થિતિં પ્રાપ્તવન્તઃ સ ઈશ્વરાદ્ યુષ્માકં જ્ઞાનં પુણ્યં પવિત્રત્વં
મુક્તિશ્ચ જાતા | 31 અતએવ ચદ્વદ્ લિખિતમાસ્તે તદ્વત્, યઃ કશ્ચિત્
શલાઘમાનઃ સ્યાત્ શલાઘતાં પ્રભુના સ હિ |

2 હે બ્રાતરો યુષ્મત્સમીપે મમાગમનકાલેડહં વક્તૃતાયા વિધાયા વા
નૈપુણ્યેનેશ્વરસ્ય સાક્ષ્યં પ્રચારિતવાન્ તન્નહિ; 2 યતો યીશુખ્રીષ્ટં તસ્ય કુશે
હતત્વઞ્ચ વિના નાન્યત્ કિમપિ યુષ્મન્મધ્યે જ્ઞાપયિતું વિહિતં બુદ્ધવાન્ | 3
અપરઞ્ચાતીવ દૌર્બલ્યભીતિકમ્પયુક્તો યુષ્માભિઃ સાર્દ્ધમાસં | 4 અપરં
યુષ્માકં વિશ્વાસો યત્ માનુષિકજ્ઞાનસ્ય ફલં ન ભવેત્ કિન્ત્વીશ્વરીયશક્તેઃ
ફલં ભવેત્, 5 તદર્થં મમ વક્તૃતા મદીયપ્રચારશ્ચ માનુષિકજ્ઞાનસ્ય
મધુરવાક્યસમ્બલિતૌ નાસ્તાં કિન્ત્વાત્મનઃ શક્તેશ્ચ પ્રમાણયુક્તાવાસ્તાં |
6 વયં જ્ઞાનં ભાષામહે તચ્ચ સિદ્ધલોકૈર્જ્ઞાનમિવ મન્યતે, તદિલ્લોકસ્ય

જ્ઞાનં નહિ, ઇહલોકસ્ય નશ્વરાણામ્ અધિપતીનાં વા જ્ઞાનં નહિ; (aiōn g165) 7 કિન્તુ કાલાવસ્થાયાઃ પૂર્વસ્માદ્ યત્ જ્ઞાનમ્ અસ્માકં વિભવાર્થમ્ ઇશ્વરેણ નિશ્ચિત્ય પ્રચ્છન્નં તન્નિગૂઢમ્ ઇશ્વરીયજ્ઞાનં પ્રભાષામહે | (aiōn g165) 8 ઇહલોકસ્યાધિપતીનાં કેનાપિ તત્ જ્ઞાનં ન લબ્ધં, લબ્ધે સતિ તે પ્રભાવવિશિષ્ટં પ્રભું કુશે નાહનિષ્યન્ | (aiōn g165) 9 તદ્વલ્લિખિતમાસ્તે, નેત્રેણ ક્કાપિ નો દૃષ્ટં કર્ણેનાપિ ચ ન શ્રુતં | મનોમધ્યે તુ કસ્યાપિ ન પ્રવિષ્ટં કદાપિ યત્ | ઇશ્વરે પ્રીયમાણાનાં કૃતે તત્ તેન સચ્ચિતં | 10 અપરમીશ્વરઃ સ્વાત્મના તદસ્માકં સાક્ષાત્ પ્રાકાશયત્; યત આત્મા સર્વમેવાનુસન્ધત્તે તેન ચેશ્વરસ્ય મર્મતત્ત્વમપિ બુધ્યતે | 11 મનુજસ્યાન્તઃસ્થમાત્માનં વિના કેન મનુજેન તસ્ય મનુજસ્ય તત્ત્વં બુધ્યતે? તદ્દદીશ્વરસ્યાત્માનં વિના કેનાપીશ્વરસ્ય તત્ત્વં ન બુધ્યતે | 12 વયઞ્ચેહલોકસ્યાત્માનં લબ્ધવન્તસ્તન્નહિ કિન્ત્વીશ્વરસ્યૈવાત્માનં લબ્ધવન્તઃ, તતો હેતોરીશ્વરેણ સ્વપ્રસાદાદ્ અસ્મભ્યં યદ્ યદ્ દત્તં તત્સર્વમ્ અસ્માભિ જ્ઞાતું શક્યતે | 13 તચ્યાસ્માભિ માર્નુષિકજ્ઞાનસ્ય વાક્યાનિ શિક્ષિત્વા કથ્યત ઇતિ નહિ કિન્ત્વાત્મતો વાક્યાનિ શિક્ષિત્વાત્મિકૈ વાક્યૈરાત્મિકં ભાવં પ્રકાશયદ્ધિઃ કથ્યતે | 14 પ્રાણી મનુષ્ય ઇશ્વરીયાત્મનઃ શિક્ષાં ન ગૃહ્ણાતિ યત આત્મિકવિચારેણ સા વિચાર્યતિ હેતોઃ સ તાં પ્રલાપમિવ મન્યતે બોદ્ધુઞ્ચ ન શક્નોતિ | 15 આત્મિકો માનવઃ સર્વાણિ વિચારયતિ કિન્તુ સ્વયં કેનાપિ ન વિચાર્યતે | 16 યત ઇશ્વરસ્ય મનો જ્ઞાત્વા તમુપદેષ્ટું કઃ શક્નોતિ? કિન્તુ ખ્રીષ્ટસ્ય મનોડસ્માભિ લબ્ધં |

3 હે ભ્રાતરઃ, અહમાત્મિકૈરિવ યુષ્માભિઃ સમં સમભાષિતું નાશક્નવં કિન્તુ શારીરિકાચારિભિઃ ખ્રીષ્ટધર્મં શિશુતુલ્યૈશ્ચ જનૈરિવ યુષ્માભિઃ સહ સમભાષે | 2 યુષ્માન્ કઠિનભક્ષ્યં ન ભોજયન્ દુગ્ધમ્ અપાયયં યતો યૂયં ભક્ષ્યં ગ્રહીતું તદા નાશક્નુત ઇદાનીમપિ ન શક્નુથ, યતો હેતોરઘુનાપિ શારીરિકાચારિણ આધ્વે | 3 યુષ્મન્મધ્યે માત્સર્ચ્યવિવાદભેદા ભવન્તિ તતઃ કિં શારીરિકાચારિણો નાધ્વે માનુષિકમાર્ગેણ ચ ન ચરથ? 4 પૌલસ્યાહમિત્યાપલ્લોરહમિતિ વા યદ્વાક્યં યુષ્માકં કૈશ્ચિત્ કૈશ્ચિત્ કથ્યતે તસ્માદ્ યૂયં શારીરિકાચારિણ ન ભવથ? 5 પૌલઃ કઃ? આપલ્લો વા કઃ? તૌ પરિચારકમાત્રૌ તયોરેકૈકસ્મૈ ચ પ્રભુ ર્યાદૃક્ ફલમદદાત્ તદ્વત્ તયોર્દ્વારા

યૂયં વિશ્વાસિનો જાતાઃ | 6 અહં રોપિતવાન્ આપલ્લોશ્ચ નિષિક્તવાન્
 ઈશ્વરશ્રાવદ્ધયત્ | 7 અતો રોપયિતૃસેક્તારાવસારૌ વદ્ધયિતેશ્વર એવ
 સારઃ | 8 રોપયિતૃસેક્તારૌ ચ સમૌ તયોરેકૈકશ્ચ સ્વશ્રમયોગ્યં સ્વવેતનં
 લપ્સ્યતે | 9 આવામીશ્વરેણ સહ કર્મકારિણૌ, ઈશ્વરસ્ય યત્ ક્ષેત્રમ્
 ઈશ્વરસ્ય યા નિર્મિતિઃ સા યૂયમેવ | 10 ઈશ્વરસ્ય પ્રસાદાત્ મયા યત્
 પદં લબ્ધં તસ્માત્ જ્ઞાનિના ગૃહકારિણેવ મયા ભિત્તિમૂલં સ્થાપિતં તદુપરિ
 યાન્થેન નિચીયતે | કિન્તુ યેન યન્નિચીયતે તત્ તેન વિવિચ્યતાં | 11
 યતો યીશુખ્રીષ્ટરૂપં યદ્ ભિત્તિમૂલં સ્થાપિતં તદન્યત્ કિમપિ ભિત્તિમૂલં
 સ્થાપયિતું કેનાપિ ન શક્યતે | 12 એતદ્ભિત્તિમૂલસ્યોપરિ યદિ કેચિત્
 સ્વાર્ણરૂપમણિકાષ્ટતૃણનલાન્ નિચિન્વન્તિ, 13 તર્હોકૈકસ્ય કર્મ પ્રકાશિષ્યતે
 યતઃ સ દિવસસ્તત્ પ્રકાશયિષ્યતિ | યતો હતોસ્તન દિવસેન વહ્નિમયેનોદેતવ્યં
 તત એકૈકસ્ય કર્મ કીદૃશમેતસ્ય પરીક્ષા બહિના ભવિષ્યતિ | 14
 યસ્ય નિચયનરૂપં કર્મ સ્થાસ્તુ ભવિષ્યતિ સ વેતનં લપ્સ્યતે | 15
 યસ્ય ચ કર્મ ધક્ષ્યતે તસ્ય ક્ષતિ ભવિષ્યતિ કિન્તુ વહ્ને નિર્ગતજન ઇવ
 સ સ્વયં પરિત્રાણં પ્રાપ્સ્યતિ | 16 યૂયમ્ ઈશ્વરસ્ય મન્દિરં યુષ્મન્મધ્યે
 યેશ્વરસ્યાત્મા નિવસતીતિ કિં ન જાનીથ? 17 ઈશ્વરસ્ય મન્દિરં યેન
 વિનાશ્યતે સોડપીશ્વરેણ વિનાશયિષ્યતે યત ઈશ્વરસ્ય મન્દિરં પવિત્રમેવ
 યૂયં તુ તન્મન્દિરમ્ આધ્યે | 18 કોપિ સ્વં ન વચ્ચયતાં | યુષ્માકં કશ્ચન
 યેદિહલોકસ્ય જ્ઞાનેન જ્ઞાનવાનહમિતિ બુદ્ધ્યતે તર્હિ સ યત્ જ્ઞાની ભવેત્
 તદર્થ મૂઢો ભવતુ | (aiōn g165) 19 યસ્માદિહલોકસ્ય જ્ઞાનમ્ ઈશ્વરસ્ય
 સાક્ષાત્ મૂઢત્વમેવ | એતસ્મિન્ લિખિતમપ્યાસ્તે, તીક્ષ્ણા યા જ્ઞાનિનાં
 બુદ્ધિસ્તયા તાન્ ધરતીશ્વરઃ | 20 પુનશ્ચ | જ્ઞાનિનાં કલ્પના વેત્તિ પરમેશો
 નિરર્થકાઃ | 21 અતએવ કોડપિ મનુજૈરાત્માનં ન શલાઘતાં યતઃ સર્વાણિ
 યુષ્માકમેવ, 22 પૌલ વા આપલ્લો વા કૈફા વા જગદ્ વા જીવનં વા મરણં
 વા વર્તમાનં વા ભવિષ્યદ્વા સર્વાણ્યેવ યુષ્માકં, 23 યૂયન્ પ્રીષ્ટસ્ય,
 પ્રીષ્ટશ્ચેશ્વરસ્ય |

4 લોકા અસ્માન્ પ્રીષ્ટસ્ય પરિચારકાન્ ઈશ્વરસ્ય
 નિગૂઢવાક્યધનસ્યાધ્યક્ષાંશ્ચ મન્યન્તાં | 2 કિન્તુ ધનાધ્યક્ષેણ વિશ્વસનીયેન
 ભવિતવ્યમેતદેવ લોકૈ ર્યાચ્યતે | 3 અતો વિચારયદ્ધિ યુષ્માભિરન્યૈઃ કૈશ્ચિન્

મનુજૈ વાં મમ પરીક્ષણં મયાતીવ લઘુ મન્યતે ડહમધ્યાત્માનં ન
 વિચારયામિ | 4 મયા કિમપ્યપરાદ્ભિત્યહં ન વેદિ કિન્ત્વેતેન મમ
 નિરપરાધત્વં ન નિશ્ચીયતે પ્રભુરેવ મમ વિચારયિતાસ્તિ | 5 અત
 ઉપયુક્તસમયાત્ પૂર્વમ્ અર્થતઃ પ્રભોરાગમનાત્ પૂર્વ્ય યુષ્માભિ વિચારો ન
 ક્રિયતાં | પ્રભુરાગત્ય તિમિરેણ પ્રચ્છન્નાનિ સર્વાણિ દીપયિષ્યતિ મનસાં
 મન્ત્રણાશ્ચ પ્રકાશયિષ્યતિ તસ્મિન્ સમય ઈશ્વરાદ્ એકૈકસ્ય પ્રશંસા
 ભવિષ્યતિ | 6 હે ભ્રાતરઃ સર્વાણ્યેતાનિ મયાત્માનમ્ આપલ્લવન્ત્રોદ્દિશ્ય
 કથિતાનિ તસ્યૈતત્ કારણં યુયં યથા શાસ્ત્રીયવિધિમતિક્રમ્ય માનવમ્ અતીવ
 નાદરિષ્યધ્મ ઈત્યઞ્ચૈકેન વૈપરીત્યાદ્ અપરેણ ન શ્લાધિષ્યધ્મ એતાદૃશીં
 શિક્ષામાવયોદ્દૃષ્ટાન્તાત્ લપ્સ્યધ્વે | 7 અપરાત્ કસ્ત્વાં વિશેષયતિ? તુભ્યં
 યન્ન દત્ત તાદૃશં કિં ધારયસિ? અદત્તેનેવ દત્તેન વસ્તુના કુતઃ શ્લાઘસે? 8
 ઇદાનીમેવ યૂયં કિં તૃપ્તા લબ્ધધના વા? અસ્માસ્વવિધમાનેષુ યૂયં કિં
 રાજત્વપદં પ્રાપ્તાઃ? યુષ્માકં રાજત્વં મયાભિલષિતં યતસ્તેન યુષ્માભિઃ સહ
 વયમપિ રાજ્યાંશિનો ભવિષ્યામઃ | 9 પ્રેરિતા વયં શેષા હન્તવ્યાશ્ચેવેશ્વરેણ
 નિદર્શિતાઃ | યતો વયં સર્વલોકાનામ્ અર્થતઃ સ્વર્ગીયદૂતાનાં માનવાનાઞ્ચ
 કૌતુકાસ્પદાનિ જાતાઃ | 10 ખ્રીષ્ટસ્ય કૃતે વયં મૂઢાઃ કિન્તુ યૂયં ખ્રીષ્ટેન
 જ્ઞાનિનઃ, વયં દુર્બ્બલા યૂયઞ્ચ સબલાઃ, યૂયં સમ્માનિતા વયઞ્ચાપમાનિતાઃ |
 11 વયમધાપિ ક્ષુધાર્તાસ્તૃષ્ણાર્તા વસ્ત્રહીનાસ્તાડિતા આશ્રમરહિતાશ્ચ
 સન્તઃ 12 કર્મણિ સ્વકરાન્ વ્યાપારયન્તશ્ચ દુઃખૈઃ કાલં યાપયામઃ |
 ગર્હિતૈરસ્માભિરાશીઃ કથ્યતે દૂરીકૃતૈઃ સહ્યતે નિન્દિતૈઃ પ્રસાધતે | 13
 વયમધાપિ જગતઃ સમ્માર્જનીયોગ્યા અવકરા ઇવ સર્વે ભંન્યામહે | 14
 યુષ્માન્ ત્રપયિતુમહમેતાનિ લિખામીતિ નહિ કિન્તુ પ્રિયાત્મજાનિવ યુષ્માન્
 પ્રબોધયામિ | 15 યતઃ ખ્રીષ્ટધર્મો યદપિ યુષ્માકં દશસહસ્રાણિ વિનેતારો
 ભવન્તિ તથાપિ બહવો જનકા ન ભવન્તિ યતોડહમેવ સુસંવાદેન યીશુખ્રીષ્ટે
 યુષ્માન્ અજનયં | 16 અતો યુષ્માન્ વિનયેડહં યૂયં મદનુગામિનો ભવત |
 17 ઇત્યર્થ સર્વેષુ ધર્મસમાજેષુ સર્વત્ર ખ્રીષ્ટધર્મયોગ્યા યે વિધયો
 મયોપદિશ્યન્તે તાન્ યો યુષ્માન્ સ્મારયિષ્યત્યેવમ્ભૂતં પ્રભોઃ કૃતે પ્રિયં
 વિશ્વાસિનઞ્ચ મદીયતનયં તીમથિયં યુષ્માકં સમીપં પ્રેષિતવાનહં | 18
 અપરમહં યુષ્માકં સમીપં ન ગમિષ્યામીતિ બુદ્ધ્વા યુષ્માકં કિયન્તો લોકા

ગર્વન્તિ| 19 કિન્તુ યદિ પ્રભેરિચ્છા ભવતિ તર્હાહમવિલમ્બં
 યુષ્મત્સમીપમુપસ્થાય તેષાં દર્પધ્માતાનાં લોકાનાં વાયં જ્ઞાસ્યામીતિ નહિ
 સામર્થ્યમેવ જ્ઞાસ્યામિ| 20 યસ્માદીશ્વરસ્ય રાજત્વં વાગ્યુક્તં નહિ કિન્તુ
 સામર્થ્યયુક્તં| 21 યુષ્માકં કા વાઞ્છા? યુષ્મત્સમીપે મયા કિં દણ્ડપાણિના
 ગન્તવ્યમુત પ્રેમનમ્રતાત્મયુક્તેન વા?

5 અપરં યુષ્માકં મધ્યે વ્યભિચારો વિધતે સ ય વ્યભિચારસ્તાદૃશો યદ્
 દેવપૂજકાનાં મધ્યેડપિ તત્તુલ્યો ન વિધતે ફલતો યુષ્માકમેકો જનો વિમાતૃગમનં
 કૃરુત ઇતિ વાર્તા સર્વત્ર વ્યાપ્તા| 2 તથાય યૂયં દર્પધ્માતા આધ્બે,
 તત્ કર્મ્મ યેન કૃતં સ યથા યુષ્મન્મધ્યાદ્ દૂરીક્રિયતે તથા શોકો યુષ્માભિ
 ન્ ક્રિયતે કિમ્ એતત્? 3 અવિધમાને મદીયશરીરે મમાત્મા યુષ્મન્મધ્યે
 વિધતે અતોડહં વિધમાન ઇવ તત્કર્મ્મકારિણો વિચારં નિશ્ચિતવાન્, 4
 અસ્મત્પ્રભો ર્થીશુપ્રીષ્ટસ્ય નામ્ના યુષ્માકં મદીયાત્મનશ્ચ મિલને જાતે
 ડસ્મત્પ્રભો ર્થીશુપ્રીષ્ટસ્ય શક્તે: સાહાય્યેન 5 સ નર: શરીરનાશાર્થમસ્માભિ:
 શયતાનો હસ્તે સમર્પયિતવ્યસ્તતોડસ્માકં પ્રભો ર્થીશો દિવસે તસ્યાત્મા રક્ષાં
 ગન્તું શક્ષ્યતિ| 6 યુષ્માકં દર્પો ન ભદ્રાય યૂયં કિમેતન્ન જાનીથ, યથા, વિકાર:
 કૃત્સ્નશક્તૂનાં સ્વલ્પકિણ્ણેન જાયતે| 7 યૂયં યત્ નવીનશક્તુસ્વરૂપા ભવેત
 તદર્થં પુરાતનં કિણ્ણવમ્ અવમાજ્જત યતો યુષ્માભિ: કિણ્ણવશૂન્યૈ ભવિતવ્યં|
 અપરમ્ અસ્માકં નિસ્તારોત્સવીયમેષશાવકો ય: પ્રીષ્ટ: સોડસ્મદર્થં બલીકૃતો
 ડભવત્| 8 અત: પુરાતનકિણ્ણેનાર્થતો દુષ્ટતાજિઘાંસારૂપેણ કિણ્ણેન તન્નહિ
 કિન્તુ સારલ્યસત્યત્વરૂપયા કિણ્ણવશૂન્યતયાસ્માભિરુત્સવ: કર્તવ્ય:| 9
 વ્યભિચારિણાં સંસર્ગો યુષ્માભિ વિહાતવ્ય ઇતિ મયા પત્રે લિખિતં| 10
 કિન્ત્વૈહિકલોકાનાં મધ્યે યે વ્યભિચારિણો લોભિન ઉપદ્રાવિણો દેવપૂજકા
 વા તેષાં સંસર્ગ: સર્વથા વિહાતવ્ય ઇતિ નહિ, વિહાતવ્યે સતિ યુષ્માભિ
 ળંગતો નિર્ગન્તવ્યમેવ| 11 કિન્તુ ભ્રાતૃત્વેન વિખ્યાત: કશ્ચિજ્જનો યદિ
 વ્યભિચારી લોભી દેવપૂજકો નિન્દકો મધપ ઉપદ્રાવી વા ભવેત્ તર્હિ તાદૃશેન
 માનવેન સહ ભોજનપાનેડપિ યુષ્માભિ ન્ કર્તવ્યે ઇત્યધુના મયા લિખિતં|
 12 સમાજબહિ:સ્થિતાનાં લોકાનાં વિચારકરણે મમ કોડધિકાર: કિન્તુ
 તદન્તર્ગતાનાં વિચારણં યુષ્માભિ: કિં ન કર્તવ્યં ભવેત્? 13 બહિ:સ્થાનાં

तु विचार ईश्वरेण कारिष्यते | अतो युष्माभिः स पातकी स्वमध्याद्
बहिष्कृत्यां |

6 युष्माकमेकस्य जनस्यापरेण सः विवादे जाते स पवित्रलोकै
र्विचारमकारयन् किम् अधार्मिकलोकैर्विचारयितुं प्रोत्सहते? 2 जगतोऽपि
विचारणं पवित्रलोकैः कारिष्यत अतद् यूयं किं न जानीथ? अतो जगद्
यदि युष्माभिर्विचारयितव्यं तर्हि क्षुद्रतमविचारेषु यूयं किमसमर्थाः? 3
दूता अप्यस्माभिर्विचारयिष्यन्त इति किं न जानीथ? अत औदिकविषयाः
किम् अस्माभिर्न विचारयितव्या भवेयुः? 4 औदिकविषयस्य विचारे
युष्माभिः कर्तव्ये ये लोकाः समितौ क्षुद्रतमास्त एव नियुज्यन्तां | 5
अहं युष्मान् त्रपयितुमिच्छन् वदामि यृष्मन्मध्ये किमेकोऽपि मनुष्यस्तादृग्
बुद्धिमान्नाहि यो ब्रातृविवाहविचारणो समर्थः स्यात्? 6 किञ्चैको ब्राता
ब्रात्रान्येन किमविश्वासिनां विचारकारणं साक्षाद् विवदते? यष्मन्मध्ये
विवाह विधन्त अतदपि युष्माकं दोषः | 7 यूयं कुतोऽन्यायसहनं क्षतिसहनं
वा श्रेयो न मन्यध्वे? 8 किन्तु यूयमपि ब्रातृनेव प्रत्यन्यायं क्षतिञ्च
कुरुथ किमेतत्? 9 ईश्वरस्य राज्येऽन्यायकारिणां लोकानामधिकारो
नास्त्येतद् यूयं किं न जानीथ? मा वञ्च्यध्वं, ये व्यभियारिणो देवाः
पारदारिकाः स्त्रीवदाचारिणः पुंमैथुनकारिणस्तस्करा 10 लोभिनो मधपा
निन्दका उपद्राविणो वा त ईश्वरस्य राज्यभागिनो न भविष्यन्ति | 11
यूयञ्चैवंविधा लोका आस्त किन्तु प्रभो र्यीशो नान्मास्मदीश्वरस्यात्मना
य यूयं प्रक्षालिताः पाविताः सपुण्यीकृताश्च | 12 महर्षे सर्व्वं द्रव्यम्
अप्रतिषिद्धं किन्तु न सर्व्वं हितजनकं | महर्षे सर्व्वमप्रतिषिद्धं तथाप्यहं
कस्यापि द्रव्यस्य वशीकृतो न भविष्यामि | 13 उदराय भक्ष्याणि
भक्ष्येभ्यश्चोदरं, किन्तु भक्ष्योदरे ईश्वरेण नाशयिष्येते; अपरं देहो न
व्यभियाराय किन्तु प्रभवे प्रभुश्च देहाय | 14 यश्चेश्वरः प्रभुमुत्थापितवान्
स स्वशक्त्यास्मानप्युत्थापयिष्यति | 15 युष्माकं यानि शरीराणि तानि
प्रीष्टस्याङ्गानीति किं यूयं न जानीथ? अतः प्रीष्टस्य यान्यङ्गानि तानि
मयापहृत्य वेश्याया अङ्गानि किं कारिष्यन्ते? तन्न भवतु | 16 यः कश्चिद्
वेश्यायाम् आसज्यते स तथा सडैकदेहो भवति किं यूयमेतन्न जानीथ?
यतो लिप्पितमास्ते, यथा, तौ द्वौ जनावेकाङ्गौ भविष्यतः | 17 मानवा

यान्यन्यानि कलुषाणि कुर्वन्ते तानि वपुर्न समाविशन्ति किन्तु व्यभियारिणा स्वविग्रहस्य विरुद्धं कल्मषं क्रियते। 18 मानवा यान्यन्यानि कलुषाणि कुर्वन्ते तानि वपुर्न समाविशन्ति किन्तु व्यभियारिणा स्वविग्रहस्य विरुद्धं कल्मषं क्रियते। 19 युष्माकं यानि वपुंसि तानि युष्मदन्तःस्थितस्येश्वराल्लब्धस्य पवित्रस्यात्मनो मन्दिराणि यूयञ्च स्वेषां स्वामिनो नाध्वे किमेतद् युष्माभिर्न ज्ञायते? 20 यूयं मूल्येन क्रीता अतो वपुर्मनोभ्याम् एश्वरो युष्माभिः पूज्यतां यत एश्वर अेव तयोः स्वामी।

7 अपरञ्च युष्माभिर्भा प्रति यत् पत्रमलेभि तस्योत्तरमेतत्, योषितोऽस्यर्शनं मनुजस्य वरं; 2 किन्तु व्यभियारभयाद् अेकैकस्य पुंसः स्वकीयभार्या भवतु तद्द्वे अेकैकस्या योषितो ऽपि स्वकीयभर्ता भवतु। 3 भार्यायै भर्ता यद्द्वे वितरणीयं तद्द्वे वितीर्यतां तद्द्वे भर्त्रेऽपि भार्याया वितरणीयं वितीर्यतां। 4 भार्यायाः स्वदेहे स्वत्वं नास्ति भर्तुरेव, तद्द्वे भर्तुरपि स्वदेहे स्वत्वं नास्ति भार्याया अेव। 5 उपोषाणप्रार्थनयोः सेवनार्थम् अेकमन्त्राणानां युष्माकं कियत्कालं यावद् या पृथक्स्थिति र्भवति तदन्यो विच्छेदो युष्मन्मध्ये न भवतु, ततः परम् इन्द्रियाणाम् अर्थैर्यात् शयतान् यद् युष्मान् परीक्षां न नयेत् तदर्थं पुनरेकत्र मिलत। 6 अेतद् आदेशतो नहि किन्तुनुज्ञात अेव मया कथ्यते, 7 यतो ममावस्थेव सर्वमानवानामवस्था भवत्विति मम वाञ्छा किन्त्वीश्वराद् अेकैकैको वरोऽन्येन यान्यो वर इत्येकैकेन स्वकीयवरो लब्धः। 8 अपरम् अकृतविवादान् विधवाश्च प्रति भूमैतन्निवेदनं भवेव तेषामवस्थिति र्भद्रा; 9 किञ्च यदि तैरिन्द्रियाणि नियन्तुं न शक्यन्ते तर्हि विवाहः क्रियतां यतः कामदहनाद् व्यूढत्वं भद्रं। 10 ये य कृतविवाहास्ते मया नहि प्रभुनैवैतद् आज्ञाप्यन्ते। 11 भार्या भर्तृतः पृथक् न भवतु। यदि वा पृथग्भूता स्यात् तर्हि निर्विवाहा तिष्ठतु स्वीयपतिना वा सन्दधातु भर्तापि भार्या न त्यजतु। 12 इतरान् जनान् प्रति प्रभुर्न ब्रवीति किन्त्वहं ब्रवीमि; कस्यचिद् भ्रातुर्योषिद् अविश्वासिनी सत्यपि यदि तेन सड्वासे तुष्यति तर्हि सा तेन न त्यज्यतां। 13 तद्द्वत् कस्याश्चिद् योषितः पतिरविश्वासी सन्नपि यदि तथा सड्वासे तुष्यति तर्हि स तथा न त्यज्यतां। 14 यतोऽविश्वासी भर्ता भार्याया पवित्रीभूतः, तद्द्वदविश्वासीनी भार्या भर्ता पवित्रीभूता; नोयेद्

યુષ્માકમપત્યાન્યશુચીન્યભવિષ્યન્ કિન્વધુના તાનિ પવિત્રાણિ સન્તિ | 15
 અવિશ્વાસી જનો યદિ વા પૃથગ્ ભવતિ તર્હિ પૃથગ્ ભવતુ; એતેન બ્રાતા
 ભગિની વા ન નિબધ્યતે તથાપિ વયમીશ્વરેણ શાન્તયે સમાહૂતાઃ | 16 હે
 નારિ તવ ભર્તુઃ પરિત્રાણં ત્વત્તો ભવિષ્યતિ ન વેતિ ત્વયા કિં જ્ઞાયતે? હે નર
 તવ જાયાયાઃ પરિત્રાણં ત્વત્તે ભવિષ્યતિ ન વેતિ ત્વયા કિં જ્ઞાયતે? 17 એકેકો
 જનઃ પરમેશ્વરાલ્લબ્ધં યદ્ ભજતે યસ્યાઞ્ચાવસ્થાયામ્ ઈશ્વરેણાહ્વાયિ
 તદનુસારેણૈવાચરતુ તદદં સર્વસમાજસ્થાન્ આદિશામિ | 18 છિન્નત્વગ્
 ભૂત્વા ય આહૂતઃ સ પ્રકૃષ્ટત્વક્ ન ભવતુ, તદ્દદ્ અછિન્નત્વગ્ ભૂત્વા ય આહૂતઃ
 સ છિન્નત્વક્ ન ભવતુ | 19 ત્વક્ષેદઃ સારો નહિ તદ્દદત્વક્ષેદોડપિ સારો નહિ
 કિન્વીશ્વરસ્યાજ્ઞાનાં પાલનમેવ | 20 યો જનો યસ્યામવસ્થાયામાહ્વાયિ સ
 તસ્યામેવાવતિષ્ઠતાં | 21 દાસઃ સન્ ત્વં કિમાહૂતોડસિ? તન્મા ચિન્તય,
 તથાય યદિ સ્વતન્ત્રો ભવિતું શક્નુયાસ્તર્હિ તદેવ વૃણુ | 22 યતઃ પ્રભુનાહૂતો
 યો દાસઃ સ પ્રભો મોચિતજનઃ | તદ્દદ્ તેનાહૂતઃ સ્વતન્ત્રો જનોડપિ ખ્રીષ્ટસ્ય
 દાસ એવ | 23 યૂયં મૂલ્યેન ક્રીતા અતો હેતો માનવાનાં દાસા મા ભવત | 24
 હે બ્રાતરો યસ્યામવસ્થાયાં યસ્યાહ્વાનમભવત્ તયા સ ઈશ્વરસ્ય સાક્ષાત્
 તિષ્ઠતુ | 25 અપરમ્ અકૃતવિવાહાન્ જનાન્ પ્રતિ પ્રભોઃ કોડપ્યાદેશો મયા
 ન લબ્ધઃ કિન્તુ પ્રભોરનુકમ્પયા વિશ્વાસ્યો ભૂતોડદં યદ્ ભદ્રં મન્યે તદ્
 વદામિ | 26 વર્તમાનાત્ કલેશસમયાત્ મનુષ્યસ્યાનૂઢત્વં ભદ્રમિતિ મયા
 બુધ્યતે | 27 ત્વં કિં યોષિતિ નિબદ્ધોડસિ તર્હિ મોચનં પ્રાપ્તું મા યતસ્વ |
 કિં વા યોષિતો મુક્તોડસિ? તર્હિ જાયાં મા ગવેષય | 28 વિવાહં કુર્વતા
 ત્વયા કિમપિ નાપારાધ્યતે તદ્દદ્ વ્યૂહ્યમાનયા યુવત્યાપિ કિમપિ નાપારાધ્યતે
 તથાય તાદૃશૌ દ્વૌ જનૌ શારીરિકં કલેશં લપ્સ્યેતે કિન્તુ યુષ્માન્ પ્રતિ મમ
 કરુણા વિદ્યતે | 29 હે બ્રાતરોડહમિદં બ્રવીમિ, ઇતઃ પરં સમયોડતીવ
 સંક્ષિપ્તઃ, 30 અતઃ કૃતદારૈરકૃતદારૈરિવ રુદદ્વિશ્ચારુદદ્વિરિવ સાનન્દૈશ્ચ
 નિરાનન્દૈરિવ કેતૃભિશ્ચાભાગિભિરિવાચરિતવ્યં 31 યે ય સંસારે ચરન્તિ તૈ
 નાંતિચરિતવ્યં યત ઇલ્લેકસ્ય કૌતુકો વિચલતિ | 32 કિન્તુ યૂયં યન્નિશ્ચિન્તા
 ભવેતેતિ મમ વાઞ્છા | અકૃતવિવાહો જનો યથા પ્રભું પરિતોષયેત્ તથા પ્રભું
 ચિન્તયતિ, 33 કિન્તુ કૃતવિવાહો જનો યથા ભાર્ય્યાં પરિતોષયેત્ તથા સંસારં
 ચિન્તયતિ | 34 તદ્દદ્ ઊઠયોષિતો ડનૂઢા વિશિષ્યતે | યાનૂઢા સા યથા

કાયમનસોઃ પવિત્રા ભવેત્ તથા પ્રભું ચિન્તયતિ યા ચોઢા સા યથા ભર્તારં
 પરિતોષયેત્ તથા સંસારં ચિન્તયતિ | 35 અહં યદ્ યુષ્માન્ મૃગબન્ધિન્યા
 પરિક્ષિપેયં તદર્થં નહિ કિન્તુ યૂયં યદનિન્દિતા ભૂત્વા પ્રભોઃ સેવનેડબાધમ્
 આસક્તા ભવેત તદર્થમેતાનિ સર્વાણિ યુષ્માકં હિતાય મયા કથ્યન્તે |
 36 કસ્યચિત્ કન્યાયાં યૌવનપ્રાપ્તાયાં યદિ સ તસ્યા અનૂઢત્વં નિન્દનીયં
 વિવાહશ્ચ સાધયિતવ્ય ઇતિ મન્યતે તર્હિ યથાભિલાષં કરોતુ, એતેન કિમપિ
 નાપરાત્સ્યતિ વિવાહઃ ક્રિયાતાં | 37 કિન્તુ દુઃખેનાકિલિષ્ટઃ કશ્ચિત્ પિતા યદિ
 સ્થિરમનોગતઃ સ્વમનોડભિલાષસાધને સમર્થશ્ચ સ્યાત્ મમ કન્યા મયા
 રક્ષિતવ્યેતિ મનસિ નિશ્ચિનોતિ ચ તર્હિ સ ભદ્રં કર્મ કરોતિ | 38 અતો
 યો વિવાહં કરોતિ સ ભદ્રં કર્મ કરોતિ યશ્ચ વિવાહં ન કરોતિ સ ભદ્રતરં
 કર્મ કરોતિ | 39 યાવન્કાલં પતિ જીવતિ તાવદ્ ભાર્યા વ્યવસ્થયા નિબદ્ધા
 તિષ્ઠતિ કિન્તુ પત્યૌ મહાનિદ્રાં ગતે સા મુક્તીભૂય યમભિલષતિ તેન સહ
 તસ્યા વિવાહો ભવિતું શક્નોતિ, કિન્ત્વેતત્ કેવલં પ્રભુભક્તાનાં મધ્યે |
 40 તથાય સા યદિ નિષ્પતિકા તિષ્ઠતિ તર્હિ તસ્યાઃ ક્ષેમં ભવિષ્યતીતિ મમ
 ભાવઃ | અપરમ્ ઈશ્વરસ્યાત્મા મમાપ્યન્ત વિંધત ઇતિ મયા બુધ્યતે |

8 દેવપ્રસાદે સર્વેષામ્ અસ્માકં જ્ઞાનમાસ્તે તદ્વ્યં વિદ્મઃ | તથાપિ જ્ઞાનં
 ગર્વ્યં જનયતિ કિન્તુ પ્રેમતો નિષ્ઠા જાયતે | 2 અતઃ કશ્ચન યદિ મન્યતે
 મમ જ્ઞાનમાસ્ત ઇતિ તર્હિ તેન યાદૃશં જ્ઞાનં ચેષ્ટિતવ્યં તાદૃશં કિમપિ
 જ્ઞાનમધાપિ ન લભ્યં | 3 કિન્તુ ય ઈશ્વરે પ્રીયતે સ ઈશ્વરેણાપિ જ્ઞાયતે |
 4 દેવતાભલિપ્રસાદભક્ષણે વયમિદં વિદ્મો યત્ જગન્મધ્યે કોડપિ દેવો ન
 વિદ્યતે, એકશ્ચેશ્વરો દ્વિતીયો નાસ્તીતિ | 5 સ્વર્ગે પૃથિવ્યાં વા યદપિ
 કેષુચિદ્ ઈશ્વર ઇતિ નામારોપ્યતે તાદૃશાશ્ચ બહવ ઈશ્વરા બહવશ્ચ
 પ્રભવો વિદ્યન્તે 6 તથાપ્યસ્માકમદ્વિતીય ઈશ્વરઃ સ પિતા યસ્માત્ સર્વેષાં
 યદર્થઞ્ચાસ્માકં સૃષ્ટિર્જાતા, અસ્માકઞ્ચાદ્વિતીયઃ પ્રભુઃ સ યીશુઃ પ્ત્રીષ્ઠો
 યેન સર્વવસ્તૂનાં યેનાસ્માકમપિ સૃષ્ટિઃ કૃતા | 7 અધિકન્તુ જ્ઞાનં સર્વેષાં
 નાસ્તિ યતઃ કેચિદધાપિ દેવતાં સમ્મન્ય દેવપ્રસાદમિવ તદ્ ભક્ત્યં ભુઞ્જતે તેન
 દુર્બલતયા તેષાં સ્વાન્તાનિ મલીમસાનિ ભવન્તિ | 8 કિન્તુ ભક્ષ્યદ્રવ્યાદ્
 વયમ્ ઈશ્વરેણ ગ્રાહ્યા ભવામસ્તન્નહિ યતો ભુઙ્ક્ત્વા વયમુત્કૃષ્ટા ન
 ભવામસ્તદ્દદ્ભુઙ્ક્ત્વાપ્યપકૃષ્ટા ન ભવામઃ | 9 અતો યુષ્માકં યા ક્ષમતા

सा दुर्बलानाम् उन्माथस्वरूपा यन्न भवेत् तदर्थं सावधाना भवत | 10
यतो ज्ञानविशिष्टस्त्वं यदि देवालये उपविष्टः केनापि दृश्यसे तर्हि तस्य
दुर्बलस्य मनसि किं प्रसादलक्षणा उत्साहो न जनिष्यते? 11 तथा सति
यस्य कृते श्रीष्टो ममार तव स दुर्बलो भ्राता तव ज्ञानात् किं न विनक्ष्यति?
12 एत्यनेन प्रकारेण भ्रातृणां विरुद्धम् अपराध्यद्विस्तेषां दुर्बलानि
मनांसि व्याघातयद्विश्च युष्माभिः श्रीष्टस्य वैपरीत्येनापराध्यते | 13 अतो
हेतोः पिशिताशनं यदि मम भ्रातुर्विघ्नस्वरूपं भवेत् तर्हां यत् स्वभ्रातु
विघ्नजनको न भवेयं तदर्थं यावज्जिवनं पिशितं न भोक्ष्ये | (aiṭn g165)

9 अहं किम् अेकः प्रेरितो नास्मि? किमहं स्वतन्त्रो नास्मि? अस्माकं प्रभु
र्यीशुः श्रीष्टः किं मया नादर्शि? यूयमपि किं प्रभुना मदीयश्रमङ्गलस्वरूपा न
भवथ? 2 अन्यलोकानां कृते यद्यप्यहं प्रेरितो न भवेयं तथाय युष्मत्कृते
प्रेरितोऽस्मि यतः प्रभुना मम प्रेरितत्वपदस्य मुद्रास्वरूपा यूयमेवाध्वे | 3 ये
लोका मयि दोषमारोपयन्ति तान् प्रति मम प्रत्युत्तरमेतत् | 4 भोजनपानयोः
किमस्माकं क्षमता नास्ति? 5 अन्ये प्रेरिताः प्रभो भ्रातरौ कैङ्गाश्च यत्
कुर्वन्ति तद्वत् काञ्चित् धर्मभगिनीं व्यूह्य तथा सार्द्धं पर्यटितुं वयं किं
न शक्नुमः? 6 सांसारिकश्रमस्य परित्यागात् किं केवलमहं भार्गव्याश्च
निवारितौ? 7 निजधनव्ययेन कः संग्रामं करोति? को वा द्राक्षाक्षेत्रं कृत्वा
तद्दलानि न भुङ्कते? को वा पशुप्रजं पालयन् तत्पयो न पिवति? 8 किमहं
केवलां मानुषिकां वायं वद्यामि? व्यवस्थायां किमेतादृशं वयनं न विधते? 9
भूसाव्यवस्थाग्रन्थे लिपितमास्ते, त्वं शस्यमर्दकवृषस्यास्यं न भन्त्यसीति |
एश्वरेण बलीवर्दानामेव यिन्ता किं क्रियते? 10 किं वा सर्वथास्माकं
कृते तद्वयनं तेनोक्तं? अस्माकमेव कृते तद्विहितं | यः क्षेत्रं कर्षति तेन
प्रत्याशायुक्तेन कर्षय्यं, यश्च शस्यानि मर्दयति तेन लाभप्रत्याशायुक्तेन
मर्दितव्यं | 11 युष्मत्कृतेऽस्माभिः पारत्रिकाणि बीजानि रोपितानि, अतो
युष्माकमैडिकङ्कलानां वयम् अंशिनो भविष्यामः किमेतत् महत् कर्म? 12
युष्मासु योऽधिकारस्तस्य भागिनो यद्यन्ये भवेयुस्तर्हास्माभिस्ततोऽधिकं किं
तस्य भागिभिर्न भवितव्यं? अधिकन्तु वयं तेनाधिकारेण न व्यवहृतवन्तः
किन्तु श्रीष्टीयसुसंवाहस्य कोऽपि व्याघातोऽस्माभिर्यन्न जायेत तदर्थं सर्वं
सहामहे | 13 अपरं ये पवित्रवस्तूनां परियर्या कुर्वन्ति ते पवित्रवस्तुतो

ભક્ષ્યાણિ લભન્તે, યે ચ વેદાઃ પરિચર્યા કુર્વન્તિ તે વેદિસ્થવસ્તૂનામ્
અંશિનો ભવન્ત્યેતદ્ યૂયં કિં ન વિદ? 14 તદ્વદ્ યે સુસંવાદં ઘોષયન્તિ તૈઃ
સુસંવાદેન જીવિતવ્યમિતિ પ્રભુનાદિષ્ટં | 15 અહમેતેષાં સર્વેષાં કિમપિ
નાશ્રિતવાન્ માં પ્રતિ તદનુસારાત્ આચરિતવ્યમિત્યાશયેનાપિ પત્રમિદં
મયા ન લિખ્યતે યતઃ કેનાપિ જનેન મમ યશસો મુઘાકરણાત્ મમ મરણં
વરં | 16 સુસંવાદઘોષણાત્ મમ યશો ન જાયતે યતસ્તદ્ઘોષણં મમાવશ્યકં
યદહં સુસંવાદં ન ઘોષયેયં તર્હિ માં ધિક્ | 17 ઇચ્છુકેન તત્ કુર્વતા
મયા ફલં લાપ્યતે કિન્ત્વનિચ્છુકેડપિ મયિ તત્કર્મણો ભારોડર્પિતોડસ્તિ |
18 એતેન મયા લભ્યં ફલં કિં? સુસંવાદેન મમ ચોડધિકાર આસ્તે તં
યદભદ્રભાવેન નાયરેયં તદર્થં સુસંવાદઘોષણસમયે તસ્ય ખ્રીષ્ટીયસુસંવાદસ્ય
નિર્વ્યંચીકરણમેવ મમ ફલં | 19 સર્વેષામ્ અનાયત્તોડહં યદ્ ભૂરિશો
લોકાન્ પ્રતિપદે તદર્થં સર્વેષાં દાસત્વમક્ષીકૃતવાન્ | 20 ચિહ્નુદીયાન્ યત્
પ્રતિપદે તદર્થં ચિહ્નુદીયાનાં કૃતે ચિહ્નુદીયઇવાભવં | યે ચ વ્યવસ્થાયતાસ્તાન્
યત્ પ્રતિપદે તદર્થં વ્યવસ્થાનાયત્તો ચોડહં સોડહં વ્યવસ્થાયતાનાં કૃતે
વ્યવસ્થાયત્તઇવાભવં | 21 યે ચાલબ્ધવ્યવસ્થાસ્તાન્ યત્ પ્રતિપદે તદર્થમ્
ઇશ્વરસ્ય સાક્ષાદ્ અલબ્ધવ્યવસ્થો ન ભૂત્વા ખ્રીષ્ટેન લબ્ધવ્યવસ્થો ચોડહં
સોડહમ્ અલબ્ધવ્યવસ્થાનાં કૃતેડલબ્ધવ્યવસ્થ ઇવાભવં | 22 દુર્બલોડાન્
યત્ પ્રતિપદે તદર્થમહં દુર્બલોડાનાં કૃતે દુર્બલઇવાભવં | ઇત્યં કેનાપિ
પ્રકારેણ કતિપયા લોકા યન્મયા પરિત્રાણં પ્રાપ્નુયુસ્તદર્થં યો યાદૃશ આસીત્
તસ્ય કૃતે ડહં તાદૃશઇવાભવં | 23 ઇદૃશ આચારઃ સુસંવાદાર્થં મયા ક્રિયતે
યતોડહં તસ્ય ફલાનાં સહભાગી ભવિતુમિચ્છામિ | 24 પણ્યલાભાર્થં યે
ધાવન્તિ ધાવતાં તેષાં સર્વેષાં કેવલ એકઃ પણ્યં લભતે યુષ્માભિઃ કિમેતન્ન
જ્ઞાયતે? અતો યૂયં યથા પણ્યં લાપ્સ્યધ્વે તથૈવ ધાવત | 25 મલ્લા અપિ
સર્વભોગે પરિમિતભોગિનો ભવન્તિ તે તુ મ્લાનાં સ્રજં લિપ્સન્તે કિન્તુ વયમ્
અમ્લાનાં લિપ્સામહે | 26 તસ્માદ્ અહમપિ ધાવામિ કિન્તુ લક્ષ્યમનુદ્દિશ્ય
ધાવામિ તન્નહિ | અહં મલ્લઇવ યુધ્યામિ ચ કિન્તુ છાયામાઘાતયન્નિવ
યુધ્યામિ તન્નહિ | 27 ઇતરાન્ પ્રતિ સુસંવાદં ઘોષયિત્વાહં યત્ સ્વયમગ્રાહ્યો
ન ભવામિ તદર્થં દેહમ્ આહન્મિ વશીકુર્વ્યં ચ |

10 હે ભ્રાતરઃ, અસ્મત્પિતૃપુરુષાનધિ યૂયં યદ્જ્ઞાતા ન તિષ્ઠેતિ મમ વાઙ્મ, તે સર્વે મેઘાઘઃસ્થિતા બભૂવુઃ સર્વે સમુદ્રમધ્યેન વવ્રજુઃ, 2 સર્વે મૂસામુદ્દિશ્ય મેઘસમુદ્રયો મ્જિજતા બભૂવુઃ 3 સર્વ્ય એકમ્ આત્મિકં ભક્ષ્યં બુભુજિર એકમ્ આત્મિકં પેયં પપુશ્ચ 4 યતસ્તેડનુચરત આત્મિકાદ્ અચલાત્ લબ્ધં તોયં પપુઃ સોડચલઃ પ્રીષ્ટએવ | 5 તથા સત્યપિ તેષાં મધ્યેડધિકેષુ લોકેષ્વીશ્વરો ન સન્તુતોષેતિ હેતોસ્તે પ્રન્તરે નિપાતિતાઃ | 6 એતસ્મિન્ તે ડસ્માકં નિદર્શનસ્વરૂપા બભૂવુઃ; અતસ્તે યથા કુત્સિતાભિલાષિણો બભૂવુરસ્માભિસ્તથા કુત્સિતાભિલાષિભિર્ન ભવિતવ્યં | 7 લિખિતમાસ્તે, લોકા ભોક્તું પાતુઓપવિવિશુસ્તતઃ ક્ષીડિતુમુત્થિતા ઇત્યનેન પ્રકારેણ તેષાં કૈશ્ચિદ્ યદ્દદ્ દેવપૂજા કૃતા યુષ્માભિસ્તદ્વત્ ન ક્રિયતાં | 8 અપરં તેષાં કૈશ્ચિદ્ યદ્દદ્ વ્યભિચારઃ કૃતસ્તેન ચૈકસ્મિન્ દિને ત્રયોવિંશતિસહસ્રાણિ લોકા નિપાતિતાસ્તદ્દદ્ અસ્માભિર્વ્યભિચારો ન કર્તવ્યઃ | 9 તેષાં કેચિદ્ યદ્દત્ પ્રીષ્ટં પરીક્ષિતવન્તસ્તસ્માદ્ ભુજકૈર્નષ્ટાશ્ચ તદ્દદ્ અસ્માભિઃ પ્રીષ્ટો ન પરીક્ષિતવ્યઃ | 10 તેષાં કેચિદ્ યથા વાક્કલહં કૃતવન્તસ્તત્કારણાત્ હન્ત્રા વિનાશિતાશ્ચ યુષ્માભિસ્તદ્દદ્ વાક્કલહો ન ક્રિયતાં | 11 તાન્ પ્રતિ યાન્યેતાનિ જઘટિરે તાન્યસ્માકં નિદર્શાનાનિ જગતઃ શેષયુગે વર્તમાનાનામ્ અસ્માકં શિક્ષાર્થં લિખિતાનિ ચ બભૂવુઃ | (aiōn g165) 12 અતએવ યઃ કશ્ચિદ્ સુસ્થિરંમન્યઃ સ યન્ન પતેત્ તત્ર સાવધાનો ભવતુ | 13 માનુષિકપરીક્ષાતિરિક્તા કાપિ પરીક્ષા યુષ્માન્ નાકામત્, ઇશ્વરશ્ચ વિશ્વાસ્યઃ સોડતિશક્ત્યાં પરીક્ષાયાં પતનાત્ યુષ્માન્ રક્ષિષ્યતિ, પરીક્ષા ચ યદ્ યુષ્માભિઃ સોદ્ધું શક્યતે તદર્થં તથા સહ નિસ્તારસ્ય પન્થાનં નિરૂપયિષ્યતિ | 14 હે પ્રિયભ્રાતરઃ, દેવપૂજાતો દૂરમ્ અપસરત | 15 અહં યુષ્માન્ વિજ્ઞાન્ મત્વા પ્રભાષે મયા યત્ કથ્યતે તદ્ યુષ્માભિર્વિવિચ્યતાં | 16 યદ્ ધન્યવાદપાત્રમ્ અસ્માભિર્ધન્યં ગદ્યતે તત્ કિં પ્રીષ્ટસ્ય શોણિતસ્ય સહભાગિત્વં નહિ? યશ્ચ પૂપોડસ્માભિર્ભજ્યતે સ કિં પ્રીષ્ટસ્ય વપુષઃ સહભાગિત્વં નહિ? 17 વયં બહવઃ સન્તોડ્યેકપૂપસ્વરૂપા એકવપુઃસ્વરૂપાશ્ચ ભવામઃ, યતો વયં સર્વ્ય એકપૂપસ્ય સહભાગિનઃ | 18 યૂયં શારીરિકમ્ ઇસ્રાયેલીયવંશં નિરીક્ષધ્વં | યે બલીનાં માંસાનિ ભુજ્જતે તે કિં યજ્ઞવેદાઃ સહભાગિનો ન ભવન્તિ? 19 ઇત્યનેન મયા કિં કથ્યતે? દેવતા વાસ્તવિકી દેવતાયૈ બલિદાનં વા વાસ્તવિકં કિં ભવેત્? 20 તન્નહિ

किन्तु भिन्नजातिभि र्ये बलयो दीयन्ते त एश्वराय तन्नहि भूतेभ्यमेव
 दीयन्ते तस्माद् यूयं यद् भूतानां सडभागिनो भवथेत्यहं नाभिलषामि |
 21 प्रभोः कंसेन भूतानामपि कंसेन पानं युष्माभिरसाध्यं; यूयं प्रभो
 भोज्यस्य भूतानामपि भोज्यस्य सडभागिनो भवितुं न शक्नुथ | 22
 वयं किं प्रभुं स्पृष्ट्वामहे? वयं किं तस्माद् बलवन्तः? 23 मां प्रति
 सर्व्वं कर्म्मप्रतिषिद्धं किन्तु न सर्व्वं हितजनकं सर्व्वम् अप्रतिषिद्धं किन्तु
 न सर्व्वं निष्ठाजनकं | 24 आत्महितः केनापि न येष्टितव्यः किन्तु सर्व्वैः
 परहितश्चेष्टितव्यः | 25 आपाणे यत् कथं तद् युष्माभिः संवेदस्यार्थं किमपि
 न पृष्ट्वा भुज्यतां 26 यतः पृथिवी तन्मध्यस्थत्र सर्व्वं परमेश्वरस्य | 27
 अपरम् अविश्वासिलोकानां केनयित् निमन्त्रिता यूयं यदि तत्र जिगमिषथ
 तर्हि तेन यद् यद् उपस्थाप्यते तद् युष्माभिः संवेदस्यार्थं किमपि न पृष्ट्वा
 भुज्यतां | 28 किन्तु तत्र यदि कश्चिद् युष्मान् वदेत् भक्ष्यमेतद् देवतायाः
 प्रसाद एति तर्हि तस्य ज्ञापयितुरनुरोधात् संवेदस्यार्थत्र तद् युष्माभि
 र्न भोक्तव्यं | पृथिवी तन्मध्यस्थत्र सर्व्वं परमेश्वरस्य, 29 सत्यमेतत्,
 किन्तु मया यः संवेदो निर्दिश्यते स तव नहि परस्यैव | 30 अनुग्रहपात्रेण
 मया धन्यवाहं कृत्वा यद् भुज्यते तत्कारणाद् अहं कुतो निन्दिष्ये? 31
 तस्माद् भोजनं पानम् अन्यद्वा कर्म्म कुर्व्वद्भि र्युष्माभिः सर्व्वमेवेश्वरस्य
 महिम्नः प्रकाशार्थं क्रियतां | 32 यिद्धूतीयानां भिन्नजातीयानाम् एश्वरस्य
 समाजस्य वा विघ्नजनकै र्युष्माभि र्न भवितव्यं | 33 अहमप्यात्महितम्
 अयेष्टमानो बहूनां परित्राणार्थं तेषां हितं येष्टमानः सर्व्वविषये सर्व्वेषां
 तुष्टिकरो भवामीत्यनेनाहं यद्वात् प्रीष्टस्यानुगामी तद्वाद् यूयं ममानुगामिनो
 भवत |

11 हे आतरः, यूयं सर्व्वस्मिन् कार्य्ये मां स्मरथ मया य
 यादृगुपदिष्टास्तादृगायरथैतत्कारणात् मया प्रशंसनीया आध्वे | 2
 तथापि ममैषा वाग्छा यद् यूयमिदम् अवगता भवथ, 3 अकैकस्य
 पुरुषस्योत्तमाङ्गस्वरूपः प्रीष्टः, योषितश्चोत्तमाङ्गस्वरूपः पुमान्, प्रीष्टस्य
 योत्तमाङ्गस्वरूप एश्वरः | 4 अपरम् आग्छादितोत्तमाङ्गेन येन पुंसा प्रार्थना
 क्रियत एश्वरीयवाणी कथ्यते वा तेन स्वीयोत्तमाङ्गम् अवज्ञायते | 5
 अनाग्छादितोत्तमाङ्गया यया योषिता य प्रार्थना क्रियत एश्वरीयवाणी

કથ્યતે વા તયાપિ સ્વીયોત્તમાઙ્ગમ્ અવજ્ઞાયતે યતઃ સા મુણ્ડિતશિરઃસદૃશા |
 6 અનાચ્છાદિતમસ્તકા યા યોષિત્ તસ્યાઃ શિરઃ મુણ્ડનીયમેવ કિન્તુ યોષિતઃ
 કેશચ્છેદનં શિરોમુણ્ડનં વા યદિ લજ્જજાજનકં ભવેત્ તર્હિ તયા સ્વશિર
 આચ્છાદતાં | 7 પુમાન્ ઈશ્વરસ્ય પ્રતિમૂર્તિઃ પ્રતિતેજઃસ્વરૂપશ્ચ તસ્માત્
 તેન શિરો નાચ્છાદનીયં કિન્તુ સીમન્તિની પુંસઃ પ્રતિબિમ્બસ્વરૂપા | 8 યતો
 યોષાતઃ પુમાન્ નોદપાદિ કિન્તુ પુંસો યોષિદ્ ઉદપાદિ | 9 અધિકન્તુ યોષિતઃ
 કૃતે પુંસઃ સૃષ્ટિર્ ન ભભૂવ કિન્તુ પુંસઃ કૃતે યોષિતઃ સૃષ્ટિર્ ભભૂવ | 10 ઇતિ
 હેતો દૂતાનામ્ આદરાદ્ યોષિતા શિરસ્યધીનતાસૂચકમ્ આવરણં ધર્તવ્યં |
 11 તથાપિ પ્રભો વિધિના પુમાંસં વિના યોષિન્ન જાયતે યોષિતઃ વિના
 પુમાન્ ન જાયતે | 12 યતો યથા પુંસો યોષિદ્ ઉદપાદિ તથા યોષિતઃ પુમાન્
 જાયતે, સર્વવસ્તૂનિ ચેશ્વરાદ્ ઉત્પદન્તે | 13 યુષ્માભિરેવૈતદ્ વિવિચ્યતાં,
 અનાવૃતયા યોષિતા પ્રાર્થનં કિં સુદૃશ્યં ભવેત્? 14 પુરુષસ્ય દીર્ઘકેશત્વં
 તસ્ય લજ્જજાજનકં, કિન્તુ યોષિતો દીર્ઘકેશત્વં તસ્યા ગૌરવજનકં 15 યત
 આચ્છાદનાય તસ્યૈ કેશા દત્તા ઇતિ કિં યુષ્માભિઃ સ્વભાવતો ન શિક્ષ્યતે?
 16 અત્ર યદિ કશ્ચિદ્ વિવદિતુમ્ ઇચ્છેત્ તર્હાસ્માકમ્ ઈશ્વરીયસમિતીનાઞ્ચ
 તાદૃશી રીતિર્ ન વિદ્યતે | 17 યુષ્માભિર્ ન ભદ્રાય કિન્તુ કુત્સિતાય સમાગમ્યતે
 તસ્માદ્ એતાનિ ભાષમાણેન મયા યૂયં ન પ્રશંસનીયાઃ | 18 પ્રથમતઃ સમિતૌ
 સમાગતાનાં યુષ્માકં મધ્યે ભેદાઃ સન્તીતિ વાર્તા મયા શ્રૂયતે તન્મધ્યે કિઞ્ચિત્
 સત્યં મન્યતે ય | 19 યતો હેતો યુષ્મન્મધ્યે યે પરીક્ષિતાસ્તે યત્ પ્રકાશ્યન્તે
 તદર્થં ભેદૈર્ ભવિતવ્યમેવ | 20 એકત્ર સમાગતૈર્ યુષ્માભિઃ પ્રભાવં ભેજ્યં
 ભુજ્યત ઇતિ નહિ; 21 યતો ભોજનકાલે યુષ્માકમેકૈકેન સ્વકીયં ભક્ષ્યં
 તૂર્ણં ગ્રસ્યતે તસ્માદ્ એકો જનો ભુભુક્ષિતસ્તિષ્ઠતિ, અન્યશ્ચ પરિતૃપ્તો
 ભવતિ | 22 ભોજનપાનાર્થં યુષ્માકં કિં વેશમાનિ ન સન્તિ? યુષ્માભિર્ વા
 કિમ્ ઈશ્વરસ્ય સમિતિં તુચ્છીકૃત્ય દીના લોકા અવજ્ઞાયન્તે? ઇત્યનેન મયા
 કિં વક્તવ્યં? યૂયં કિં મયા પ્રશંસનીયાઃ? એતસ્મિન્ યૂયં ન પ્રશંસનીયાઃ |
 23 પ્રભુતો ય ઉપદેશો મયા લબ્ધો યુષ્માસુ સમર્પિતશ્ચ સ એષઃ | 24
 પરકરસમર્પણક્ષપાયાં પ્રભુર્ યૌશુઃ પૂપમાદાયેશ્વરં ધન્યં વ્યાહત્ય તં ભક્ત્વા
 ભાષિતવાન્ યુષ્માભિરેતદ્ ગૃહ્યતાં ભુજ્યતાઞ્ચ તદ્ યુષ્મત્કૃતે ભગ્નં મમ
 શરીરં; મમ સ્મરણાર્થં યુષ્માભિરેતત્ ક્રિયતાં | 25 પુનશ્ચ ભેજનાત્ પરં

तथैव कंसम् आदाय तेनोक्तं कंसोऽयं मम शोणितेन स्थापितो नूतननियमः;
यतिवारं युष्माभिरेतत् पीयते ततिवारं मम स्मरणार्थं पीयतां | 26 यतिवारं
युष्माभिरेष पूषो भुञ्ज्यते भाजनेनानेन पीयते य ततिवारं प्रभोरगमनं
यावत् तस्य मृत्युः प्रकाश्यते | 27 अपरञ्च यः कश्चिद् अयोग्यत्वेन प्रभोरिभं
पूपम् अश्नाति तस्यानेन भाजनेन पिवति य स प्रभोः कायरुधिरयो
र्दण्डाधी भविष्यति | 28 तस्मात् मानवेनाग्र आत्मान परीक्ष्य पश्चाद्
अेष पूषो भुञ्ज्यतां कंसेनानेन य पीयतां | 29 येन यानर्हत्वेन भुञ्ज्यते
पीयते य प्रभोः कायम् अविमृशता तेन दण्डप्राप्तये भुञ्ज्यते पीयते य | 30
अेतत्कारणाद् युष्माकं भूरिशो लोका दुर्बला रोगिणश्च सन्ति बडवश्च
महानिद्रां गताः | 31 अस्माभि र्यथात्मवियारोऽकारिष्यत तर्हि दण्डो
नालभ्यतः; 32 किन्तु यदास्माकं वियारो भवति तदा वयं जगतो जनैः समं
यद् दण्डं न लभामहे तदर्थं प्रभुना शास्त्रिं भुञ्जमहे | 33 हे मम भ्रातरः,
भोजनार्थं मिलितानां युष्माकम् अकेनेतरोऽनुगृह्यतां | 34 यश्च बुभुक्षितः
स स्वगृहे भुङ्क्तां | दण्डप्राप्तये युष्माभि र्न समागम्यतां | अेतद्विन्नं यद्
आदृष्टव्यं तद् युष्मत्समीपागमनकाले मयादृश्यते |

12 हे भ्रातरः, यूयं यद् आत्मिकान् दायान् अनवगतास्तिष्ठथ तदहं
नाभिलषामि | 2 पूर्व्यं भिन्नजातीया यूयं यद्दद् विनीतास्तद्दद्
अवाक्प्रतिमानाम् अनुगामिन आध्वम् एति जानीथ | 3 एति हेतोरहं
युष्मत्स्यं निवेदयामि, एश्वरस्यात्मना भाषमाणः कोऽपि यीशुं शप्त
एति न व्याहरति, पुनश्च पवित्रेणात्मना विनीतं विनान्यः कोऽपि यीशुं
प्रभुरिति व्याहर्तुं न शक्नोति | 4 दायो बहुविधाः किन्त्वेक आत्मा
5 परियय्याश्च बहुविधाः किन्त्वेकः प्रभुः | 6 साधनानि बहुविधानि
किन्तु सर्वेषु सर्वसाधक एश्वर अकः | 7 अकैकस्मै तस्यात्मनो दर्शनं
परहितार्थं दीयते | 8 अकस्मै तेनात्मना ज्ञानवाक्यं दीयते, अन्यस्मै
तेनैवात्मनादृष्टं विधावाक्यम्, 9 अन्यस्मै तेनैवात्मना विश्वासः, अन्यस्मै
तेनैवात्मना स्वास्थ्यदानशक्तिः, 10 अन्यस्मै दुःसाध्यसाधनशक्तिरन्यस्मै
येश्वरीयादेशः, अन्यस्मै यातिमानुषिकस्यादेशस्य वियारसामर्थ्यम्,
अन्यस्मै परभाषाभाषणशक्तिरन्यस्मै य भाषार्थभाषणसामर्थ्यं दीयते |
11 अकेनाद्वितीयेनात्मना यथाभिलाषम् अकैकस्मै जनार्थकैकं दानं वितरता

तानि सर्वाणि साध्यन्ते। 12 देह अेकः सन्नपि यद्वद् बहुयुक्तो
 भवति, तस्यैकस्य वपुषो ऽङ्गानां बहुत्वेन यद्वद् अेकं वपु भवति,
 तद्वत् प्रीष्टः। 13 यतो हेतो र्द्युष्टिभिन्नजातीयदासस्वतन्त्रा वयं सर्वे
 भज्जनेनैकेनात्मनैकदेहीकृताः सर्वे यैकात्मभुक्ता अभवाम। 14 अेकेनाङ्गेन
 वपु र्न भवति किन्तु बहुभिः। 15 तत्र यरणं यदि वदेत् नाहं हस्तस्तस्मात्
 शरीरस्य भागो नास्मीति तर्हनेन शरीरात् तस्य वियोगो न भवति। 16
 श्रोत्रं वा यदि वदेत् नाहं नयनं तस्मात् शरीरस्यांशो नास्मीति तर्हनेन
 शरीरात् तस्य वियोगो न भवति। 17 कृत्स्नं शरीरं यदि दर्शनेन्द्रियं
 भवेत् तर्हि श्रवणेन्द्रियं कुत्र स्थास्यति? तत् कृत्स्नं यदि वा श्रवणेन्द्रियं
 भवेत् तर्हि घ्राणेन्द्रियं कुत्र स्थास्यति? 18 किन्त्विदानीम् एश्वरेण
 यथाभिलषितं तथैवाङ्गप्रत्यङ्गानाम् अेकैकं शरीरे स्थापितं। 19 तत् कृत्स्नं
 यथेकाङ्गपि भवेत् तर्हि शरीरे कुत्र स्थास्यति? 20 तस्माद् अङ्गानि
 बहुनि सन्ति शरीरं त्वेकमेव। 21 अतएव त्वया मम प्रयोजनं नास्तीति
 वायं पाणिं वदितुं नयनं न शक्नोति, तथा युवाभ्यां मम प्रयोजनं
 नास्तीति मूर्द्धा यरणौ वदितुं न शक्नोतिः; 22 वस्तुतस्तु विग्रहस्य
 यान्यङ्गान्यस्माभि र्दुर्बलानि बुध्यन्ते तान्येव सप्रयोजनानि सन्ति। 23
 यानि य शरीरमध्येऽवमन्यानि बुध्यते तान्यस्मात्तिरधिकं शोभ्यन्ते।
 यानि य कुदृश्यानि तानि सुदृश्यतराणि क्रियन्ते 24 किन्तु यानि स्वयं
 सुदृश्यानि तेषां शोभनम् निष्प्रयोजनं। 25 शरीरमध्ये यद् भेदो न
 भवेत् किन्तु सर्वाण्यङ्गानि यद् अैक्यभावेन सर्वेषां हितं चिन्तयन्ति
 तदर्थम् एश्वरेणाप्रधानम् आदरणीयं कृत्वा शरीरं विरचितं। 26 तस्माद्
 अेकस्याङ्गस्य पीडायां जातायां सर्वाण्यङ्गानि तेन सह पीडयन्ते, अेकस्य
 समादरे जाते य सर्वाणि तेन सह संहृष्यन्ति। 27 यूयञ्च प्रीष्टस्य शरीरं,
 युष्माकम् अेकैकश्च तस्यैकैकम् अङ्गं। 28 केचित् केचित् समितावीश्वरेण
 प्रथमतः प्रेरिता द्वितीयत एश्वरीयादेशवक्तारस्तृतीयत उपदेष्टारो नियुक्ताः,
 ततः परं केभ्योऽपि चित्रकार्यसाधनसामर्थ्यम् अनामयकरणशक्तिरुपकृतौ
 लोकशासने वा नैपुण्यं नानाभाषाभाषासामर्थ्यं वा तेन व्यतारि। 29
 सर्वे किं प्रेरिताः? सर्वे किम् एश्वरीयादेशवक्तारः? सर्वे किम् उपदेष्टारः?
 सर्वे किं चित्रकार्यसाधकाः? 30 सर्वे किम् अनामयकरणशक्तियुक्ताः?

सर्वे किं परभाषावादिनः? सर्वे वा किं परभाषार्थप्रकाशकाः? 31 यूयं
श्रेष्ठद्यायान् लब्धुं यतध्वं | अनेन यूयं मया सर्वोत्तममार्गं दर्शयितव्याः |

13 मर्त्यस्वर्गायाणां भाषा भाषमाणोऽहं यदि प्रेमहीनो भवेयं तर्हि
वाहकतालस्वरूपो निनाहकारिभेरीस्वरूपश्च भवामि | 2 अपरञ्च यदहम्
इश्वरीयादेशाढ्यः स्यां सर्वार्णि गुप्तवाक्यानि सर्वविधाञ्च जानीयां
पूर्वाविश्वासः सन् शैलान् स्थानान्तरीकर्तुं शक्नुयाञ्च किन्तु यदि प्रेमहीनो
भवेयं तर्हाणानीय अवे भवामि | 3 अपरं यदहम् अन्नदानेन सर्वस्वं
त्यजेयं दाडनाय स्वशरीरं समर्पयेयञ्च किन्तु यदि प्रेमहीनो भवेयं तर्हि
तत्सर्वं महर्षं निष्कलं भवति | 4 प्रेम चिरसङ्घिषु ङितैषि य, प्रेम निर्द्वेषम्
अशठं निर्गर्वञ्च | 5 अपरं तत् कुत्सितं नायरति, आत्मयेष्टां न कुरुते
सहसा न कुड्यति परानिष्टं न चिन्तयति, 6 अधर्मे न तुष्यति सत्य अवे
सन्तुष्यति | 7 तत् सर्वं तितिक्षते सर्वत्र विश्वसिति सर्वत्र भद्रं प्रतीक्षते
सर्वं सहते य | 8 प्रेमो लोपः कदापि न भविष्यति, इश्वरीयादेशकथनं
लोप्यते परभाषाभाषाणं निवर्त्तिष्यते ज्ञानमपि लोपं यास्यति | 9
यतोऽस्माकं ज्ञानं भाऽऽमात्रम् इश्वरीयादेशकथनमपि भाऽऽमात्रं | 10
किन्त्वस्मासु सिद्धतां गतेषु तानि भाऽऽमात्राणि लोपं यास्यन्ते | 11
बाल्यकालेऽहं बाल इवाभाषे बाल इवाचिन्तयञ्च किन्तु यौवने जाते
तत्सर्वं बाल्यायरणं परित्यक्तवान् | 12 इदानीम् अब्रमध्येनास्पष्टं
दर्शनम् अस्माभिर्लभ्यते किन्तु तदा साक्षात् दर्शनं लभ्यते | अधुना मम
ज्ञानम् अल्पिष्ठं किन्तु तदाहं यथावगम्यस्तथैवावगतो भविष्यामि | 13
इदानीं प्रत्ययः प्रत्याशा प्रेम य त्रीण्येतानि तिष्ठन्ति तेषां मध्ये य प्रेम
श्रेष्ठं |

14 यूयं प्रेमायरणो प्रयतध्वम् आत्मिकान् दायानपि विशेषत
इश्वरीयादेशकथनसामर्थ्यं प्राप्नुं येष्टध्वं | 2 यो जनः परभाषां भाषते स
मानुषान् न सम्भाषते किन्त्वीश्वरमेव यतः केनापि किमपि न बुध्यते स
यात्मना निगूढवाक्यानि कथयति; 3 किन्तु यो जन इश्वरीयादेशं कथयति स
परेषां निष्ठायै ङितोपदेशाय सान्त्वनायै च भाषते | 4 परभाषावाधात्मन
अवे निष्ठां जनयति किन्त्वीश्वरीयादेशवादी समिते निष्ठां जनयति | 5
युष्माकं सर्वेषां परभाषाभाषणम् इच्छाम्यहं किन्त्वीश्वरीयादेशकथनम्

અધિકમપીચ્છામિ | યતઃ સમિતે નિષ્ઠાયૈ યેન સ્વવાક્યાનામ્ અર્થો ન ક્રિયતે
 તસ્માત્ પરભાષાવાદિત ઇશ્વરીયાદેશવાદી શ્રેયાન્ | 6 હે ભ્રાતરઃ, ઇદાનીં
 મયા યદિ યુષ્મત્સમીપં ગમ્યતે તર્હીશ્વરીયદર્શનસ્ય જ્ઞાનસ્ય વેશ્વરીયાદેશસ્ય
 વા શિક્ષાયા વા વાક્યાનિ ન ભાષિત્વા પરભાષાં ભાષમાણેન મયા યૂયં
 કિમુપકારિષ્યધ્વે? 7 અપરં વંશીવલ્લક્યાદિષુ નિષ્પ્રાણિષુ વાધયન્ત્રેષુ
 વાદિતેષુ યદિ ક્કણા ન વિશિષ્યન્તે તર્હિ કિં વાધં કિં વા ગાનં ભવતિ
 તત્ કેન બોદ્ધું શક્યતે? 8 અપરં રણતૂર્યાં નિસ્વાણો યધવ્યક્તો ભવેત્
 તર્હિ યુદ્ધાય કઃ સજ્જિષ્યતે? 9 તદ્વત્ જિહ્વામિ ર્થદિ સુગમ્યા વાક્
 યુષ્મામિ ન ગધેત તર્હિ યદ્ ગધતે તત્ કેન ભોત્સ્યતે? વસ્તુતો યૂયં
 દિગાલાપિન ઇવ ભવિષ્યથ | 10 જગતિ કતિપ્રકારા ઉક્તયો વિધન્તે?
 તાસામેકાપિ નિરર્થિકા નહિ; 11 કિન્તૂક્તેરર્થો યદિ મયા ન બુદ્ધ્યતે તર્હ્યં
 વક્ત્રા મ્લેચ્છ ઇવ મંસ્યે વક્તાપિ મયા મ્લેચ્છ ઇવ મંસ્યતે | 12 તસ્માદ્
 આત્મિકદાયલિપ્સવો યૂયં સમિતે નિષ્ઠાર્થં પ્રાપ્તબહુવરા ભવિતું યતધ્વં, 13
 અતએવ પરભાષાવાદી યદ્ અર્થકરોડપિ ભવેત્ તત્ પ્રાર્થયતાં | 14 યદ્યં
 પરભાષયા પ્રર્થનાં કુર્યાં તર્હિ મદીય આત્મા પ્રાર્થયતે, કિન્તુ મમ બુદ્ધિ
 નિષ્ફલા તિષ્ઠતિ | 15 ઇત્યનેન કિં કરણીયં? અહમ્ આત્મના પ્રાર્થયિષ્યે
 બુદ્ધ્યાપિ પ્રાર્થયિષ્યે; અપરં આત્મના ગાસ્યામિ બુદ્ધ્યાપિ ગાસ્યામિ | 16
 ત્વં યદાત્મના ધન્યવાદં કરોષિ તદા યદ્ વદસિ તદ્ યદિ શિષ્યેનેવોપસ્થિતેન
 જનેન ન બુદ્ધ્યતે તર્હિ તવ ધન્યવાદસ્યાન્તે તથાસ્તિવતિ તેન વક્તં કથં
 શક્યતે? 17 ત્વં સમ્યગ્ ઇશ્વરં ધન્યં વદસીતિ સત્યં તથાપિ તત્ર પરસ્ય
 નિષ્ઠા ન ભવતિ | 18 યુષ્માકં સર્વોભ્યોડહં પરભાષાભાષણે સમર્થોડસ્મીતિ
 કારણાદ્ ઇશ્વરં ધન્યં વદામિ; 19 તથાપિ સમિતૌ પરોપદેશાર્થં મયા
 કથિતાનિ પત્ર વાક્યાનિ વરં ન ચ લક્ષં પરભાષીયાનિ વાક્યાનિ | 20 હે
 ભ્રાતરઃ, યૂયં બુદ્ધ્યા બાલકાઇવ મા ભૂત પરન્તુ દુષ્ટતયા શિશવઇવ ભૂત્વા
 બુદ્ધ્યા સિદ્ધા ભવત | 21 શાસ્ત્ર ઇદં લિખિતમાસ્તે, યથા, ઇત્યવોચત્
 પરેશોડહમ્ આભાષિષ્ય ઇમાન્ જનાન્ | ભાષાભિઃ પરકીયાભિ વર્કત્રૈશ્ચ
 પરદેશિભિઃ | તથા મયા કૃતેડપીમે ન ગ્રહીષ્યન્તિ મદ્વચઃ | | 22 અતએવ
 તત્ પરભાષાભાષણં અવિશ્વાસિનઃ પ્રતિ ચિહ્નરૂપં ભવતિ ન ચ વિશ્વાસિનઃ
 પ્રતિ; કિન્ત્વીશ્વરીયાદેશકથનં નાવિશ્વાસિનઃ પ્રતિ તદ્ વિશ્વાસિનઃ પ્રત્યેવ |

23 સમિતિભુક્તેષુ સર્વેષુ એકસ્મિન્ સ્થાને મિલિત્વા પરભાષાં ભાષમાણેષુ
 યદિ જ્ઞાનાકાઙ્ક્ષિણોઽવિશ્વાસિનો વા તત્રાગચ્છેયુસ્તર્હિ યુષ્માન્ ઉન્મતાન્
 કિં ન વદિષ્યન્તિ? 24 કિન્તુ સર્વેષ્વીશ્વરીયાદેશં પ્રકાશયત્સુ યદવિશ્વાસી
 જ્ઞાનાકાઙ્ક્ષી વા કશ્ચિત્ તત્રાગચ્છતિ તર્હિ સર્વૈરેવ તસ્ય પાપજ્ઞાનં
 પરીક્ષા ચ જાયતે, 25 તતસ્તસ્યાન્તઃકરણસ્ય ગુપ્તકલ્પનાસુ વ્યક્તીભૂતાસુ
 સોઽધોમુખઃ પતન્ ઈશ્વરમારાધ્ય યુષ્મન્મધ્ય ઈશ્વરો વિદ્યતે ઇતિ સત્યં
 કથામેતાં કથયિષ્યતિ | 26 હે ભ્રાતરઃ, સમ્મિલિતાનાં યુષ્માકમ્ એકેન ગીતમ્
 અન્યેનોપદેશોઽન્યેન પરભાષાન્યેન ઐશ્વરિકદર્શનમ્ અન્યેનાર્થબોધકં વાક્યં
 લભ્યતે કિમેતત્? સર્વમેવ પરનિષ્ઠાર્થં યુષ્માભિઃ ક્રિયતાં | 27 યદિ કશ્ચિદ્
 ભાષાન્તરં વિવક્ષતિ તર્હોકસ્મિન્ દિને દ્વિજનેન ત્રિજનેન વા પરભાષા કથ્યતાં
 તદધિકૈર્ન કથ્યતાં તૈરપિ પર્યાયાનુસારાત્ કથ્યતાં, એકેન ચ તદર્થો બોધ્યતાં |
 28 કિન્ત્વર્થાભિધાયકઃ કોઽપિ યદિ ન વિદ્યતે તર્હિ સ સમિતૌ વાચંચમઃ
 સ્થિત્વેશ્વરાયાત્મને ચ કથાં કથયતુ | 29 અપરં દ્વૌ ત્રયો વેશ્વરીયાદેશવક્તારઃ
 સ્વં સ્વમાદેશં કથયન્તુ તદન્યે ચ તં વિચારયન્તુ | 30 કિન્તુ તત્રાપરેણ કેનચિત્
 જનેનેશ્વરીયાદેશે લબ્ધે પ્રથમેન કથનાત્ નિવર્તિતવ્યં | 31 સર્વે યત્ શિક્ષાં
 સાન્ત્વનાઞ્ચ લભન્તે તદર્થં યૂયં સર્વે પર્યાયેણેશ્વરીયાદેશં કથયિતું શક્નુથ |
 32 ઈશ્વરીયાદેશવક્તૃણાં મનાંસિ તેષામ્ અધીનાનિ ભવન્તિ | 33 યત ઈશ્વરઃ
 કુશાસનજનકો નહિ સુશાસનજનક એવેતિ પવિત્રલોકાનાં સર્વસમિતિષુ
 પ્રકાશતે | 34 અપરઞ્ચ યુષ્માકં વનિતાઃ સમિતિષુ તૂષણીમ્ભૂતાસ્તિષ્ઠન્તુ યતઃ
 શાસ્ત્રલિખિતેન વિધિના તાઃ કથાપ્રચારણાત્ નિવારિતાસ્તાભિ નિર્દ્યાભિ
 ભવિતવ્યં | 35 અતસ્તા યદિ કિમપિ જિજ્ઞાસન્તે તર્હિ ગેહેષુ પતીન્ પૃચ્છન્તુ
 યતઃ સમિતિમધ્યે યોષિતાં કથાકથનં નિન્દનીયં | 36 ઐશ્વરં વચઃ કિં
 યુષ્મત્તો નિરગમત? કેવલં યુષ્માન્ વા તત્ કિમ્ ઉપાગતં? 37 યઃ કશ્ચિદ્
 આત્માનમ્ ઈશ્વરીયાદેશવક્તારમ્ આત્મનાવિષ્ટં વા મન્યતે સ યુષ્માન્ પ્રતિ
 મયા યદ્ યત્ લિપ્યતે તત્રભુનાજ્ઞાપિતમ્ ઇત્યુરરી કરોતુ | 38 કિન્તુ યઃ
 કશ્ચિત્ અજ્ઞો ભવતિ સોઽજ્ઞ એવ તિષ્ઠતુ | 39 અતએવ હે ભ્રાતરઃ, યૂયમ્
 ઈશ્વરીયાદેશકથનસામર્થ્યં લબ્ધું યતદ્ધ્વં પરભાષાભાષણમપિ યુષ્માભિ ન
 નિવાર્યતાં | 40 સર્વકર્માણિ ચ વિધ્યનુસારતઃ સુપરિપાટ્યા ક્રિયન્તાં |

15 हे भ्रातरः, यः सुसंवाद्यो मया युष्मत्समीपे निवेदितो यूयञ्च यं
 गृहीतवन्त आश्रितवन्तश्च तं पुनर्युष्मान् विज्ञापयामि | 2 युष्माकं विश्वासो
 यदि वितथो न भवेत् तर्हि सुसंवाद्युक्तानि मम वाक्यानि स्मरतां युष्माकं
 तेन सुसंवाद्येन परित्राणं जायते | 3 यतोऽहं यद् यत् ज्ञापितस्तदनुसारात्
 युष्मासु मुभ्यां यां शिक्षां समार्पयं सेयं, शास्त्रानुसारात् श्रीष्टोऽस्माकं
 पापमोयनार्थं प्राणान् त्यक्तवान्, 4 श्मशाने स्थापितश्च तृतीयदिने
 शास्त्रानुसारात् पुनरुत्थापितः | 5 स यात्रे कैकै ततः परं द्वादशशिष्येभ्यो
 दर्शनं दत्तवान् | 6 ततः परं पञ्चशताधिकसंभ्यकेभ्यो भ्रातृभ्यो युगपद्
 दर्शनं दत्तवान् तेषां केचित् मडानिद्रां गता बडुतराश्चाधापि वर्तन्ते |
 7 तदनन्तरं यादूबाय तत्पश्चात् सर्वेभ्यः प्रेरितेभ्यो दर्शनं दत्तवान् |
 8 सर्वशेषेऽकालजाततुल्यो योऽहं, सोऽहमपि तस्य दर्शनं प्राप्तवान् |
 9 एश्वरस्य समितिं प्रति दौरात्म्यायरणाद् अहं प्रेरितनाम धर्तुम्
 अयोग्यस्तस्मात् प्रेरितानां मध्ये क्षुद्रतमश्चास्मि | 10 यादृशोऽस्मि तादृश
 एश्वरस्यानुग्रहेणैवास्मि; अपरं मां प्रति तस्यानुग्रहो निष्कलो नाभवत्,
 अन्येभ्यः सर्वेभ्यो मयाधिकः श्रमः कृतः, किन्तु स मया कृतस्तन्महि
 मत्सहकारिश्वरस्यानुग्रहेणैव | 11 अतएव मया भवेत् तैर्वा भवेत्
 अस्माभिस्तादृशी वार्ता घोष्यते सैव य युष्माभि विश्वासेन गृहीता |
 12 मृत्युदशातः श्रीष्ट उत्थापित इति वार्ता यदि तमधि घोष्यते तर्हि
 मृतलोडानाम् उत्थितिर्नास्तीति वाग् युष्माकं मध्ये कैश्चित् कुतः कथ्यते? 13
 मृतानाम् उत्थिति र्यदि न भवेत् तर्हि श्रीष्टोऽपि नोत्थापितः 14 श्रीष्टश्च
 यधनुत्थापितः स्यात् तर्ह्यस्माकं घोषाणं वितथं युष्माकं विश्वासोऽपि
 वितथः | 15 वयञ्चेश्वरस्य मृषासाक्षिणो भवामः, यतः श्रीष्ट स्तेनोत्थापितः
 इति साक्ष्यम् अस्माभिरीश्वरमधि दत्तं किन्तु मृतानामुत्थिति र्यदि न भवेत्
 तर्हि स तेन नोत्थापितः | 16 यतो मृतानामुत्थिति र्यति न भवेत् तर्हि
 श्रीष्टोऽप्युत्थापितत्वं न गतः | 17 श्रीष्टस्य यधनुत्थापितः स्यात् तर्हि
 युष्माकं विश्वासो वितथः, यूयम् अधापि स्वपापेषु मग्नास्तिष्ठथ | 18
 अपरं श्रीष्टाश्रिता ये मानवा मडानिद्रां गतास्तेऽपि नाशं गताः | 19 श्रीष्टो
 यदि केवलमिडलोके ऽस्माकं प्रत्याशात्मभिः स्यात् तर्हि सर्वमर्त्येभ्यो वयमेव
 दुर्भाग्याः | 20 एदानीं श्रीष्टो मृत्युदशात उत्थापितो मडानिद्रागतानां मध्ये

પ્રથમફલસ્વરૂપો જાતશ્ચ | 21 યતો યદ્વત્ માનુષદ્વારા મૃત્યુઃ પ્રાદુર્ભૂતસ્તદ્વત્
 માનુષદ્વારા મૃતાનાં પુનરુત્થિતિરપિ પ્રદુર્ભૂતા | 22 આદમા યથા સર્વો
 મરણાધીના જાતાસ્તથા પ્રીષ્ટેન સર્વો જીવયિષ્યન્તે | 23 કિન્તવેકેકેન જનેન
 નિજે નિજે પર્યાય ઉત્થાતવ્યં પ્રથમતઃ પ્રથમજાતફલસ્વરૂપેન પ્રીષ્ટેન,
 દ્વિતીયતસ્તસ્યાગમનસમયે પ્રીષ્ટસ્ય લોકેઃ | 24 તતઃ પરમ્ અન્તો ભવિષ્યતિ
 તદાનોં સ સર્વો શાસનમ્ અધિપતિત્વં પરાક્રમઞ્ચ લુપ્ત્વા સ્વપિતરીશ્વરે
 રાજત્વં સમર્પયિષ્યતિ | 25 યતઃ પ્રીષ્ટસ્ય શિપવઃ સર્વો યાવત્ તેન
 સ્વપાદયોરધો ન નિપાતયિષ્યન્તે તાવત્ તેનૈવ રાજત્વં કર્તવ્યં | 26 તેન
 વિજેતવ્યો યઃ શેષશિપુઃ સ મૃત્યુરેવ | 27 લિખિતમાસ્તે સર્વાણિ તસ્ય
 પાદયો વંશીકૃતાનિ | કિન્તુ સર્વાણ્યેવ તસ્ય વશીકૃતાનીત્યુક્તે સતિ
 સર્વાણિ યેન તસ્ય વશીકૃતાનિ સ સ્વયં તસ્ય વશીભૂતો ન જાત ઇતિ
 વ્યક્તં | 28 સર્વેષુ તસ્ય વશીભૂતેષુ સર્વાણિ યેન પુત્રસ્ય વશીકૃતાનિ
 સ્વયં પુત્રોડપિ તસ્ય વશીભૂતો ભવિષ્યતિ તત ઇશ્વરઃ સર્વેષુ સર્વં એવ
 ભવિષ્યતિ | 29 અપરં પરેતલોકાનાં વિનિમયેન યે મજ્જન્તે તૈઃ કિં
 લપ્સ્યતે? યેષાં પરેતલોકાનામ્ ઉત્થિતિઃ કેનાપિ પ્રકારેણ ન ભવિષ્યતિ તેષાં
 વિનિમયેન કુતો મજ્જનમપિ તૈરજ્ઞીક્રિયતે? 30 વયમપિ કુતઃ પ્રતિદાણં
 પ્રાણભીતિમ્ અઙ્ગીકુર્મહે? 31 અસ્મત્પ્રભુના યીશુપ્રીષ્ટેન યુષ્મત્તો મમ યા
 શ્લાઘાસ્તે તસ્યાઃ શપથં કૃત્વા કથયામિ દિને દિનેડહં મૃત્યું ગચ્છામિ | 32
 ઇન્દ્રિયનગરે વન્યપશુભિઃ સાર્દ્ધં યદિ લૌકિકભાવાત્ મયા યુદ્ધં કૃતં તર્હિ તેન
 મમ કો લાભઃ? મૃતાનામ્ ઉત્થિતિ યદિ ન ભવેત્ તર્હિ, કુર્મો ભોજનપાનેડધ
 શ્વસ્તુ મૃત્યુ ભવિષ્યતિ | 33 ઇત્યનેન ધર્માત્ મા ભ્રંશધ્વં | કુસંસર્ગેણ
 લોકાનાં સદાચારો વિનશ્યતિ | 34 યૂયં યથોચિતં સચૈતન્યાસ્તિષ્ઠત, પાપં
 મા કુરુધ્વં, યતો યુષ્માકં મધ્ય ઇશ્વરીયજ્ઞાનહીનાઃ કેડપિ વિધન્તે યુષ્માકં
 ત્રપાયૈ મયેદં ગદ્યતે | 35 અપરં મૃતલોકાઃ કથમ્ ઉત્થાસ્યન્તિ? કીદૃશં
 વા શરીરં લબ્ધ્વા પુનરેષ્યન્તીતિ વાક્યં કશ્ચિત્ પ્રક્ષ્યતિ | 36 હે અજા
 ત્વયા યદ્ બીજમ્ ઉપ્યતે તદ્ યદિ ન મ્રિયેત તર્હિ ન જીવયિષ્યતે | 37
 યયા મૂર્ત્યા નિર્ગન્તવ્યં સા ત્વયા નોપ્યતે કિન્તુ શુષ્કં બીજમેવ; તસ્ય
 ગોધૂમાદીનાં કિમપિ બીજં ભવિતું શકનોતિ | 38 ઇશ્વરેણેવ યથાભિલાષં
 તસ્મૈ મૂર્તિ દીયતે, એકેકસ્મૈ બીજાય સ્વા સ્વા મૂર્તિરેવ દીયતે | 39 સર્વાણિ

પલલોના નૈકવિધો સન્તિ, મનુષ્યપશુપક્ષિમત્સ્યાદીનાં ભિન્નરૂપો
 પલલોના સન્તિ | 40 અપરં સ્વર્ગીયા મૂર્તયઃ પાર્થિવા મૂર્તયશ્ચ વિધન્તે
 કિન્તુ સ્વર્ગીયાનામ્ એકરૂપં તેજઃ પાર્થિવાનાઞ્ચ તદન્યરૂપં તેજોઽસ્તિ | 41
 સૂર્યસ્ય તેજ એકવિધં ચન્દ્રસ્ય તેજસ્તદન્યવિધં તારાણાઞ્ચ તેજોઽન્યવિધં,
 તારાણાં મધ્યેઽપિ તેજસસ્તારતમ્યં વિધતે | 42 તત્ર લિખિતમાસ્તે યથા,
 ‘આદિપુરુષ આદમ્ જીવત્રાણી બભૂવ,’ કિન્ત્વન્તિમ આદમ્ (પ્રીષ્ઠો)
 જીવનદાયક આત્મા બભૂવ | 43 યદ્ ઉચ્યતે તત્ તુચ્છં યચ્ચોત્થાસ્યતિ તદ્
 ગૌરવાન્વિતં; યદ્ ઉચ્યતે તન્નિર્બલં યચ્ચોત્થાસ્યતિ તત્ શક્તિયુક્તં |
 44 યત્ શરીરમ્ ઉચ્યતે તત્ પ્રાણાનાં સદ્, યચ્ચ શરીરમ્ ઉત્થાસ્યતિ
 તદ્ આત્મનઃ સદ્ | પ્રાણસદ્સવરૂપં શરીરં વિધતે, આત્મસદ્સવરૂપમપિ
 શરીરં વિધતે | 45 તત્ર લિખિતમાસ્તે યથા, આદિપુરુષ આદમ્ જીવત્રાણી
 બભૂવ, કિન્ત્વન્તિમ આદમ્ (પ્રીષ્ઠો) જીવનદાયક આત્મા બભૂવ | 46
 આત્મસદ્ ન પ્રથમં કિન્તુ પ્રાણસદૈવ તત્પશ્ચાદ્ આત્મસદ્ | 47 આદઃ
 પુરુષે મૃદ ઉત્પન્નત્વાત્ મૃદમયો દ્વિતીયશ્ચ પુરુષઃ સ્વર્ગાદ્ આગતઃ પ્રભુઃ |
 48 મૃદમયો યાદૃશ આસીત્ મૃદમયાઃ સર્વે તાદૃશા ભવન્તિ સ્વર્ગીયશ્ચ
 યાદૃશોઽસ્તિ સ્વર્ગીયાઃ સર્વે તાદૃશા ભવન્તિ | 49 મૃદમયસ્ય રૂપં યદ્દદ્
 અસ્માભિ ધારિતં તદ્દત્ સ્વર્ગીયસ્ય રૂપમપિ ધારયિષ્યતે | 50 હે ભ્રાતરઃ,
 યુષ્માન્ પ્રતિ વ્યાહરામિ, ઈશ્વરસ્ય રાજ્યે રક્તમાંસયોરધિકારો ભવિતું
 ન શકનોતિ, અક્ષયત્વે ય ક્ષયસ્યાધિકારો ન ભવિષ્યતિ | 51 પશ્યતાહં
 યુષ્મભ્યં નિગૂઢાં કથાં નિવેદયામિ | 52 સર્વેરસ્માભિ મહાનિદ્રા ન ગમિષ્યતે
 કિન્ત્વન્તિમદિને તૂચ્યાં વાદિતાયામ્ એકસ્મિન્ વિપલે નિમિષૈકમધ્યે સર્વે
 રૂપાન્તરં ગમિષ્યતે, યતસ્તૂરી વાદિષ્યતે, મૃતલોકાશ્રાક્ષયીભૂતા ઉત્થાસ્યન્તિ
 વયઞ્ચ રૂપાન્તરં ગમિષ્યામઃ | 53 યતઃ ક્ષયાણીયેનૈતેન શરીરેણાક્ષયત્વં
 પરિહિતવ્યં, મરણાધીનેનૈતેન દેહેન યામરત્વં પરિહિતવ્યં | 54 એતસ્મિન્
 ક્ષયાણીયે શરીરે ઽક્ષયત્વં ગતે, એતસ્મન્ મરણાધીને દેહે યામરત્વં ગતે
 શાસ્ત્રે લિખિતં વચનમિદં સેત્સ્યતિ, યથા, જયેન ગ્રસ્યતે મૃત્યુઃ | 55
 મૃત્યો તે કણ્ટકં કુત્ર પરલોક જયઃ ક્ક તે | | (Hadēs 986) 56 મૃત્યોઃ
 કણ્ટકં પાપમેવ પાપસ્ય ય બલં વ્યવસ્થા | 57 ઈશ્વરશ્ચ ધન્યો ભવતુ યતઃ
 સોઽસ્માકં પ્રભુના યીશુપ્રીષ્ઠેનાસ્માન્ જયયુક્તાન્ વિધાપયતિ | 58 અતો હે

મમ પ્રિયભ્રાતરઃ; યૂયં સુસ્થિરા નિશ્ચલાશ્ચ ભવત પ્રભોઃ સેવાયાં યુષ્માકં
પરિશ્રમો નિષ્ફલો ન ભવિષ્યતીતિ જ્ઞાત્વા પ્રભોઃ કાર્યે સદા તત્પરા ભવત |

16 પવિત્રલોકાનાં કૃતે યોડર્થસંગ્રહસ્તમધિ ગાલાતીયદેશસ્ય સમાજા મયા
યદ્ આદિષ્ટાસ્તદ્ યુષ્માભિરપિ ક્રિયતાં | 2 મમાગમનકાલે યદ્ અર્થસંગ્રહો ન
ભવેત્ તન્નિમિત્તં યુષ્માકમેકેકેન સ્વસમ્પદાનુસારાત્ સત્રયં કૃત્વા સપ્તાહસ્ય
પ્રથમદિવસે સ્વસમીપે કિઞ્ચિત્ નિક્ષિપ્યતાં | 3 તતો મમાગમનસમયે યૂયં
યાનેવ વિશ્વાસ્યા ઇતિ વેદિષ્યથ તેભ્યોડહં પત્રાણિ દત્વા યુષ્માકં તદ્દાનસ્ય
ચિરશાલમં નયનાર્થં તાન્ પ્રેષયિષ્યામિ | 4 કિન્તુ યદિ તત્ર મમાપિ ગમનમ્
ઉચિતં ભવેત્ તર્હિ તે મયા સહ યાસ્યન્તિ | 5 સામ્પ્રતં માકિદનિયાદેશમહં
પર્યટામિ તં પર્યટ્ય યુષ્મત્સમીપમ્ આગમિષ્યામિ | 6 અનન્તરં કિં જાનામિ
યુષ્મત્સન્નિધિમ્ અવસ્થાસ્યે શીતકાલમપિ યાપયિષ્યામિ ચ પશ્યાત્ મમ
યત્ સ્થાનં ગન્તવ્યં તત્રૈવ યુષ્માભિરહં પ્રેરયિતવ્યઃ | 7 યતોડહં યાત્રાકાલે
ક્ષણમાત્રં યુષ્માન્ દ્રષ્ટું નેચ્છામિ કિન્તુ પ્રભુ ર્યધનુજાનીયાત્ તર્હિ કિઞ્ચિદ્
દીર્ઘકાલં યુષ્મત્સમીપે પ્રવસ્તુમ્ ઇચ્છામિ | 8 તથાપિ નિસ્તારોત્સવાત્
પરં પત્રાશત્તમદિનં યાવદ્ ઇકિષ્પુર્ય્યાં સ્થાસ્યામિ | 9 યસ્માદ્ અત્ર
કાર્યસાધનાર્થં મમાન્તિકે બૃહદ્ દ્વારં મુક્તં બહવો વિપક્ષા અપિ વિધન્તે |
10 તિમથિ ર્યદિ યુષ્માકં સમીપમ્ આગચ્છેત્ તર્હિ યેન નિર્ભયં યુષ્મન્મધ્યે
વર્તેત તત્ર યુષ્માભિ મનો નિધીયતાં યસ્માદ્ અહં યાદૃક્ સોડપિ તાદૃક્ પ્રભોઃ
કર્મણો યતતે | 11 કોડપિ તં પ્રત્યનાદરં ન કરોતુ કિન્તુ સ મમાન્તિકં યદ્
આગન્તું શક્નુયાત્ તદર્થં યુષ્માભિઃ સકુશલં પ્રેષ્યતાં | ભ્રાતૃભિઃ સાર્દ્ધમહં
તં પ્રતીક્ષે | 12 આપલ્લું ભ્રાતરમધ્યહં નિવેદયામિ ભ્રાતૃભિઃ સાકં સોડપિ
યદ્ યુષ્માકં સમીપં વ્રજેત્ તદર્થં મયા સ પુનઃ પુનર્યાચિતઃ કિન્તિવદાનીં
ગમનં સર્વથા તસ્મૈ નારોચત, ઇતઃપરં સુસમયં પ્રાપ્ય સ ગમિષ્યતિ | 13
યૂયં જાગૃત વિશ્વાસે સુસ્થિરા ભવત પૌરુષં પ્રકાશયત બલવન્તો ભવત |
14 યુષ્માભિઃ સર્વાણિ કર્મ્માણિ પ્રેમ્ના નિષ્પાધન્તાં | 15 હે ભ્રાતરઃ,
અહં યુષ્માન્ ઇદમ્ અભિયાયે સ્તિજ્ઞાનસ્ય પરિજના આખ્યાયાદેશસ્ય
પ્રથમજાતફલસ્વરૂપાઃ, પવિત્રલોકાનાં પરિચર્યાયૈ ચ ત આત્મનો ન્યવેદયન્
ઇતિ યુષ્માભિ જ્ઞાયતે | 16 અતો યૂયમપિ તાદૃશલોકાનામ્ અસ્મત્સહાયાનાં
શ્રમકારિણાઞ્ચ સર્વેષાં વશ્યા ભવત | 17 સ્તિજ્ઞાનઃ કર્તૂનાત આખ્યાયિકશ્ચ

यद् अत्रागमन् तेनाडम् आनन्दामि यतो युष्माभिर्यत् न्यूनितं तत् तैः
सम्पूरितं | 18 तै र्युष्माकं मम य मनांस्याप्यायितानि | तस्मात् तादृशा
लोका युष्माभिः सम्मन्तव्याः | 19 युष्मत्स्यम् आशियादेशस्थसमाजानां
नमस्कृतिम् आर्किडलप्रिस्किडलयोस्तन्माएऽपस्थसमितेश्च ङुनमस्कृतिं
प्रजानीत | 20 सर्व्वे त्रातरो युष्मान् नमस्कृर्व्वन्ते | यूयं पवित्रयुम्भनेन
मिथो नमत | 21 पौलोऽहं स्वकरलिपितं नमस्कृतिं युष्मान् वेदये | 22 यद्दि
कश्चिद् यीशुःप्रीष्टे न प्रीयते तर्हि स शापग्रस्तो भवेत् प्रभुरायाति | 23
अस्माकं प्रभो र्यीशुःप्रीष्टस्यानुग्रहो युष्मान् प्रति भूयात् | 24 प्रीष्टं यीशुम्
आश्रितान् युष्मान् प्रति मम प्रेम तिष्ठतु | इति | |

૨ કરિન્ધિનઃ

1 ઈશ્વરસ્યેચ્છયા ચીશુપ્રીષ્ટસ્ય પ્રેરિતઃ પૌલસ્તિમથિભ્રાતા ચ દ્વાવેતૌ કરિન્ધનગરસ્થાયૈ ઈશ્વરીયસમિતય આખાયાદેશસ્થેભ્યઃ સર્વૈભ્યઃ પવિત્રલોકેભ્યશ્ચ પત્રં લિખતઃ| 2 અસ્માકં તાતસ્યેશ્વરસ્ય પ્રભોર્યોશુપ્રીષ્ટસ્ય ચાનુગ્રહઃ શાન્તિશ્ચ યુષ્માસુ વર્તતાં| 3 કૃપાલુઃ પિતા સર્વસાન્તવનાકારીશ્વરશ્ચ યોડસ્મત્પ્રભોર્યોશુપ્રીષ્ટસ્ય તાત ઈશ્વરઃ સ ધન્યો ભવતુ| 4 યતો વયમ્ ઈશ્વરાત્ સાન્તવનાં પ્રાપ્ય તયા સાન્તવનયા યત્ સર્વવિધક્લિષ્ટાન્ લોકાન્ સાન્તવયિતું શક્નુયામ તદર્થં સોડસ્માકં સર્વકલેશસમયેડસ્માન્ સાન્તવયતિ| 5 યતઃ પ્રીષ્ટસ્ય કલેશા યદ્વદ્ બાહુલ્યેનાસ્માસુ વર્તન્તે તદ્વદ્ વયં પ્રીષ્ટેન બહુસાન્તવનાઢ્યા અપિ ભવામઃ| 6 વયં યદિ ક્લિષ્ટયામહે તર્હિ યુષ્માકં સાન્તવનાપરિત્રાણયોઃ કૃતે ક્લિષ્ટયામહે યતોડસ્માભિ ર્યાદૃશાનિ દુઃખાનિ સઘ્નન્તે યુષ્માકં તાદૃશદુઃખાનાં સહનેન તૌ સાધયિષ્યેતે ઇત્યસ્મિન્ યુષ્માનધિ મમ દૃઢા પ્રત્યાશા ભવતિ| 7 યદિ વા વયં સાન્તવનાં લભામહે તર્હિ યુષ્માકં સાન્તવનાપરિત્રાણયોઃ કૃતે તામપિ લભામહે| યતો યૂયં યાદૃગ્ દુઃખાનાં ભાગિનોડભવત તાદૃક્ સાન્તવનાયા અપિ ભાગિનો ભવિષ્યથેતિ વયં જાનીમઃ| 8 હે ભ્રાતરઃ, આશિયાદેશે યઃ કલેશોડસ્માન્ આક્રામ્યત્ તં યૂયં યદ્ અનવગતાસ્તિષ્ઠત તન્મયા ભદ્રં ન મન્યતે| તેનાતિશક્તિકલેશેન વયમતીવ પીડિતાસ્તસ્માત્ જીવનરક્ષણે નિરુપાયા જાતાશ્ચ, 9 અતો વયં સ્વેષુ ન વિશ્વસ્ય મૃતલોકાનામ્ ઉત્થાપયિતરીશ્વરે યદ્ વિશ્વાસં કુર્મસ્તદર્થમ્ અસ્માભિઃ પ્રાણદાણ્ડો ભોક્તવ્ય ઇતિ સ્વમનસિ નિશ્ચિતં| 10 એતાદૃશભયકુરાત્ મૃત્યો ર્યો ડસ્માન્ અત્રાયતેદાનીમપિ ત્રાયતે સ ઇતઃ પરમચ્ચસ્માન્ ત્રાસ્યતે ડસ્માકમ્ એતાદૃશી પ્રત્યાશા વિધતે| 11 એતદર્થમસ્મત્કૃતે પ્રાર્થનયા વયં યુષ્માભિરુપકર્તવ્યાસ્તથા કૃતે બહુભિ ર્યાયિતો યોડનુગ્રહોડસ્માસુ વર્તિષ્યતે તત્કૃતે બહુભિરીશ્વરસ્ય ધન્યવાદોડપિ કારિષ્યતે| 12 અપરઞ્ચ સંસારમધ્યે વિશેષતો યુષ્મન્મધ્યે વયં સાંસારિક્યા ધિયા નહિ કિન્તવીશ્વરસ્યાનુગ્રહેણાકુટિલતામ્ ઈશ્વરીયસારલ્યઞ્ચાયરિતવન્તોડત્રાસ્માકં મનો યત્ પ્રમાણં દદાતિ તેન વયં શ્લાઘામહે| 13 યુષ્માભિ ર્યદ્ યત્ પઠયતે ગૃહ્યતે ય તદન્યત્ કિમપિ

યુષ્મભ્યમ્ અસ્માભિ ન લિખ્યતે તચ્યાન્તં યાવદ્ યુષ્માભિ ગ્રહીષ્યત
 ઇત્યસ્માકમ્ આશા | 14 યૂયમિતઃ પૂર્વમપ્યસ્માન્ અંશતો ગૃહીતવન્તઃ,
 યતઃ પ્રભો ર્યોશુષ્રીષ્ટસ્ય દિને યદ્દદ્ યુષ્માસ્વસ્માકં શલાઘા તદ્દદ્ અસ્માસુ
 યુષ્માકમપિ શલાઘા ભવિષ્યતિ | 15 અપરં યૂયં યદ્ દ્વિતીયં વરં લભધ્વે
 તદર્થમિતઃ પૂર્વં તયા પ્રત્યાશયા યુષ્મત્સમીપં ગમિષ્યામિ 16 યુષ્મદ્દેશેન
 માકિદનિયાદેશં પ્રજિત્વા પુનસ્તસ્માત્ માકિદનિયાદેશાત્ યુષ્મત્સમીપમ્
 એત્ય યુષ્માભિ રિહ્લુદાદેશં પ્રેષયિષ્યે એતિ મમ વાઙ્છાસીત્ | 17 એતાદૃશી
 મન્ત્રણા મયા કિં યાઞ્ચલ્યેન કૃતા? યદ્ યદ્ અહં મન્ત્રયે તત્ કિં વિષયિલોકઇવ
 મન્ત્રયાણ આદૌ સ્વીકૃત્ય પશ્ચાદ્ અસ્વીકૃત્વ્યે? 18 યુષ્માન્ પ્રતિ મયા
 કથિતાનિ વાક્યાન્યગ્રે સ્વીકૃતાનિ શેષેડસ્વીકૃતાનિ નાભવન્ એતેનેશ્વરસ્ય
 વિશ્વસ્તતા પ્રકાશતે | 19 મયા સિલ્વાનેન તિમથિના ચેશ્વરસ્ય પુત્રો યો
 યીશુષ્રીષ્ઠો યુષ્મન્મધ્યે ઘોષિતઃ સ તેન સ્વીકૃતઃ પુનરસ્વીકૃતશ્ચ તન્નાહિ કિન્તુ
 સ તસ્ય સ્વીકારસ્વરૂપએવ | 20 ઈશ્વરસ્ય મહિમા યદ્ અસ્માભિઃ પ્રકાશેત
 તદર્થમ્ ઈશ્વરેણ યદ્ યત્ પ્રતિજ્ઞાતં તત્સર્વ્વં ખ્રીષ્ટેન સ્વીકૃતં સત્યીભૂતઞ્ચ |
 21 યુષ્માન્ અસ્માંશ્રાભિષિચ્ય યઃ ખ્રીષ્ટે સ્થાસ્નૂન્ કરોતિ સ ઈશ્વર એવ |
 22 સ યાસ્માન્ મુદ્રાક્રિતાન્ અકાર્ષીત્ સત્યાઙ્કારસ્ય પણ્ભરૂપમ્ આત્માનં
 અસ્માકમ્ અન્તઃકરણેષુ નિરક્ષિપચ્ય | 23 અપરં યુષ્માસુ કરુણાં કુર્વન્
 અહમ્ એતાવત્કાલં યાવત્ કરિન્થનગરં ન ગતવાન્ ઇતિ સત્યમેતસ્મિન્
 ઈશ્વરં સાક્ષિણં કૃત્વા મયા સ્વપ્રાણાનાં શપથઃ ક્રિયતે | 24 વયં યુષ્માકં
 વિશ્વાસસ્ય નિચન્તારો ન ભવામઃ કિન્તુ યુષ્માકમ્ આનન્દસ્ય સહાયા
 ભવામઃ, યસ્માદ્ વિશ્વાસે યુષ્માકં સ્થિતિ ભવતિ |

2 અપરઞ્ચાહં પુનઃ શોકાય યુષ્મત્સન્નિધિં ન ગમિષ્યામીતિ મનસિ
 નિરયૈષં | 2 યસ્માદ્ અહં યદિ યુષ્માન્ શોકયુક્તાન્ કરોમિ તર્હિ મયા યઃ
 શોકયુક્તીકૃતસ્તં વિના કેનાપરેણાહં હર્ષયિષ્યે? 3 મમ યો હર્ષઃ સ યુષ્માકં
 સર્વેષાં હર્ષ એવેતિ નિશ્ચિતં મયાબોધિઃ અતએવ યૈરહં હર્ષયિતવ્યસ્તૈ
 મ્દુષ્ટપસ્થિતિસમયે યન્મમ શોકો ન જાયેત તદર્થમેવ યુષ્મભ્યમ્ એતાદૃશં
 પત્રં મયા લિખિતં | 4 વસ્તુતસ્તુ બહુકલેશસ્ય મનઃપીડાયાશ્ચ સમયેડહં
 બહુશ્રુપાતેન પત્રમેકં લિખિતવાન્ યુષ્માકં શોકાર્થં તન્નાહિ કિન્તુ યુષ્માસુ
 મદીયપ્રેમબાહુલ્યસ્ય જ્ઞાપનાર્થં | 5 યેનાહં શોકયુક્તીકૃતસ્તેન કેવલમહં

शोकयुक्तीकृतस्तन्नाडि किन्त्वंशतो यूयं सर्व्वेऽपि यतोऽहमत्र कस्मिंश्चिद्
दोषमारोपयितुं नेच्छामि | 6 अहूनां यत् तज्जर्जनं तेन जनेनालम्बि तत्
तदर्थं प्रयुरं | 7 अतः स दुःखसागरे यन्न निमज्जति तदर्थं युष्माभिः स
क्षान्तव्यः सान्त्वयितव्यश्च | 8 एति हेतोः प्रथयेऽहं युष्माभिस्तस्मिन् दया
क्रियतां | 9 यूयं सर्व्वकर्म्मणि ममादेशं गृह्णीथ न वेति परीक्षितुम् अहं
युष्मान् प्रति लिप्पितवान् | 10 यस्य यो दोषो युष्माभिः क्षम्यते तस्य
स दोषो मयापि क्षम्यते यश्च दोषो मया क्षम्यते स युष्माकं कृते श्रीष्टस्य
साक्षात् क्षम्यते | 11 शयतानः कल्पनास्माभिरज्ञाता नडि, अतो वयं यत्
तेन न वञ्चयामहे तदर्थम् अस्माभिः सावधानै र्वितव्यं | 12 अपरञ्च
श्रीष्टस्य सुसंवाद्योषणार्थं मयि त्रोयानगरमागते प्रभोः कर्म्मणे य मदर्थं
द्वारे मुक्ते 13 सत्यपि स्वत्प्रातुस्तीतस्याविधमानत्वात् मदीयात्मनः कापि
शान्ति र्ना भवूव, तस्माद् अहं तान् विसज्जर्जनं यायित्वा माकिदनियादेशं
गन्तुं प्रस्थानम् अकरवं | 14 य ईश्वरः सर्व्वदा श्रीष्टेनास्मान् जयिनः करोति
सर्व्वत्र यास्माभिस्तदीयज्ञानस्य गन्धं प्रकाशयति स धन्यः | 15 यस्माद्
ये त्राणं लप्स्यन्ते ये य विनाशं गमिष्यन्ति तान् प्रति वयम् ईश्वरेण
श्रीष्टस्य सौगन्ध्यं भवामः | 16 वयम् अकेषां मृत्यवे मृत्युगन्धा अपरेषाञ्च
श्रवनाय श्रवणगन्धा भवामः, किन्त्वेतादृशकर्म्मसाधने कः समर्थोऽस्ति?
17 अन्ये अहवो लोका यद्गद् ईश्वरस्य वाक्यं मृषाशिक्षया मिश्रयन्ति वयं
तद्गत् तन्न मिश्रयन्तः सरलभावेनेश्वरस्य साक्षाद् ईश्वरस्याद्देशात् श्रीष्टेन
कथां भाषामहे |

3 वयं किम् आत्मप्रशंसनं पुनरारभामहे? युष्मान् प्रति युष्मत्तो वा
परेषां केषाञ्चिद् एवास्माकमपि किं प्रशंसापत्रेषु प्रयोजनम् आस्ते? 2
यूयमेवास्माकं प्रशंसापत्रं तय्यास्माकम् अन्तःकरणेषु लिप्पितं सर्व्वमानवैश्च
ज्ञेयं पठनीयञ्च | 3 यतो ऽस्माभिः सेवितं श्रीष्टस्य पत्रं यूयपेव, तस्य
न मस्या किन्त्वमरस्येश्वरस्यात्मना लिप्पितं पाषाणपत्रेषु तन्नाडि किन्तु
कव्यमयेषु हृत्पत्रेषु लिप्पितमिति सुस्पष्टं | 4 श्रीष्टेनेश्वरं प्रत्यस्माकम्
ईदृशो दृढविश्वासो विधते; 5 वयं निजगुणेन किमपि कल्पयितुं
समर्था एति नडि किन्त्वीश्वराद्स्माकं सामर्थ्यं जायते | 6 तेन वयं
नूतननियमस्यार्थतो ऽक्षरसंस्थानस्य तन्नाडि किन्त्वात्मन अेव सेवनसामर्थ्यं

પ્રાપ્તાઃ | અક્ષરસંસ્થાનં મૃત્યુજનકં કિન્ત્વાત્મા જીવનદાયકઃ | 7 અક્ષરૈ
વિલિખિતપાષાણરૂપિણી યા મૃત્યોઃ સેવા સા યદીદૃક્ તેજસ્વિની જાતા
યત્તસ્યાચિરસ્થાયિનસ્તેજસઃ કારણાત્ મૂસસો મુખમ્ ઇસ્રાયેલીયલોકૈઃ
સંદ્રષ્ટું નાશક્યત, 8 તદ્દર્શાત્મનઃ સેવા કિં તતોડપિ બહુતેજસ્વિની ન
ભવેત્? 9 દાડજનિકા સેવા યદિ તેજોયુક્તા ભવેત્ તર્હિ પુણ્યજનિકા
સેવા તતોડધિકં બહુતેજોયુક્તા ભવિષ્યતિ | 10 ઉભયોસ્તુલનાયાં કૃતાયામ્
એકસ્યાસ્તેજો દ્વિતીયાયાઃ પ્રખરતરેણ તેજસા હીનતેજો ભવતિ | 11
યસ્માદ્ યત્ લોપનીયં તદ્ યદિ તેજોયુક્તં ભવેત્ તર્હિ યત્ ચિરસ્થાયિ તદ્
બહુતરતેજોયુક્તમેવ ભવિષ્યતિ | 12 ઇદૃશીં પ્રત્યાશાં લબ્ધ્વા વયં મહતીં
પ્રગલ્ભતાં પ્રકાશયામઃ | 13 ઇસ્રાયેલીયલોકા યત્ તસ્ય લોપનીયસ્ય તેજસઃ
શેષં ન વિલોકયેયુસ્તદર્થ મૂસા યાદૃગ્ આવરણેન સ્વમુખમ્ આચ્છાદયત્ વયં
તાદૃક્ ન કુર્મઃ | 14 તેષાં મનાંસિ કઠિનીભૂતાનિ યતસ્તેષાં પઠનસમયે સ
પુરાતનો નિયમસ્તેનાવરણેનાધાપિ પ્રચ્છન્નસ્તિષ્ઠતિ | 15 તચ્ચ ન દૂરીભવતિ
યતઃ શ્રીષ્ટેનૈવ તત્ લુપ્યતે | મૂસસઃ શાસ્ત્રસ્ય પાઠસમયેડધાપિ તેષાં મનાંસિ
તેનાવરણેન પ્રચ્છાધન્તે | 16 કિન્તુ પ્રભું પ્રતિ મનસિ પરાવૃત્તે તદ્ આવરણં
દૂરીકારિષ્યતે | 17 યઃ પ્રભુઃ સ એવ સ આત્મા યત્ર ય પ્રભોરાત્મા તત્રૈવ
મુક્તિઃ | 18 વયઞ્ચ સર્વોડનાચ્છાદિતેનાસ્યેન પ્રભોસ્તેજસઃ પ્રતિબિમ્બં
ગૃહ્ણન્ત આત્મસ્વરૂપેણ પ્રભુના રૂપાન્તરીકૃતા વદ્ધ્માનતેજોયુક્તાં તામેવ
પ્રતિમૂર્તિં પ્રાપ્નુમઃ |

4 અપરઞ્ચ વયં કરુણાભાજો ભૂત્વા યદ્ એતત્ પરિચારકપદમ્
અલભામહિ નાત્ર કલામ્યામઃ, 2 કિન્તુ ત્રપાયુક્તાનિ પ્રચ્છન્નકર્મ્માણિ
વિહાય કુટિલતાચરણમકુર્વન્ત ઇશ્વરીયવાક્યં મિથ્યાવાક્યૈરમિશ્રયન્તઃ
સત્યધર્મસ્ય પ્રકાશનેનેશ્વરસ્ય સાક્ષાત્ સર્વમાનવાનાં સંવેદગોચરે સ્વાન્
પ્રશંસનીયાન્ દર્શયામઃ | 3 અસ્માભિ ઘોષિતઃ સુસંવાદો યદિ પ્રચ્છન્નઃ;
સ્યાત્ તર્હિ યે વિનંક્ષ્યન્તિ તેષામેવ દૃષ્ટિતઃ સ પ્રચ્છન્નઃ; 4 યત ઇશ્વરસ્ય
પ્રતિમૂર્તિર્યઃ શ્રીષ્ટસ્તસ્ય તેજસઃ સુસંવાદસ્ય પ્રભા યત્ તાન્ ન દીપયેત્ તદર્થમ્
ઇહ લોકસ્ય દેવોડવિશ્વાસિનાં જ્ઞાનનયનમ્ અન્ધીકૃતવાન્ એતસ્યોદાહરણં
તે ભવન્તિ | (aiṅ g165) 5 વયં સ્વાન્ ઘોષયામ ઇતિ નહિ કિન્તુ શ્રીષ્ટં યીશું
પ્રભુમેવાસ્માંશ્ચ યીશોઃ કૃતે યુષ્માકં પરિચારકાન્ ઘોષયામઃ | 6 ય ઇશ્વરો

मध्येतिमिरं प्रत्नां दीपनायाद्विशत् स यीशुप्रीष्टस्यास्य ष्वरीयतेजसो
 ज्ञानप्रभाया उदयार्थम् अस्माकम् अन्तःकरणेषु दीपितवान् | 7 अपरं
 तद् धनम् अस्माभिर्भूयमेषु भाजनेषु धार्यते यतः साद्गुता शक्ति
 नास्माकं किन्तुश्वरस्यैवेति ज्ञातव्यं | 8 वयं पदे पदे पीडयामहे किन्तु
 नावसीदामः, वयं व्याकुलाः सन्तोऽपि निरुपाया न भवामः; 9 वयं
 प्रद्रव्यमाना अपि न क्लाम्यामः, निपातिता अपि न विनश्यामः |
 10 अस्माकं शरीरे श्रीष्टस्य ज्वनं यत् प्रकाशेत तदर्थं तस्मिन् शरीरे
 यीशो भरणमपि धारयामः | 11 यीशो ज्वनं यद् अस्माकं मर्त्यदेहे
 प्रकाशेत तदर्थं ज्वन्तो वयं यीशोः कृते नित्यं मृत्यौ समर्थाभिहे | 12
 एत्थं वयं मृत्याकान्ता यूयञ्च ज्वनाकान्ताः | 13 विश्वासकारणादेव
 समभाषि मया वयः | एति यथा शास्त्रे लिखितं तथैवास्माभिरपि
 विश्वासजनकम् आत्मानं प्राप्य विश्वासः क्रियते तस्माच्च वयांसि
 भाष्यन्ते | 14 प्रभु र्थीशु र्येनोत्थापितः स यीशुनास्मान्प्युत्थापयिष्यति
 युष्माभिः साद्धं स्वसमीप उपस्थापयिष्यति य, वयम् अेतत् जानीमः | 15
 अतयेव युष्माकं हिताय सर्वमेव भवति तस्माद् बहूनां प्रयुरानुग्रहप्राप्ते
 र्बहुलोकानां धन्यवादेनेश्वरस्य महिमा सम्यक् प्रकाशिष्यते | 16 ततो
 हेतो वयं न क्लाम्यामः किन्तु ब्राह्मणपुरुषो यद्यपि क्षीयते तथाप्यान्तरिकः
 पुरुषो दिने दिने नूतनायते | 17 क्षणमात्रस्थायि यदेतत् लघिष्ठं दुःखं
 तद् अतिबाहुल्येनास्माकम् अनन्तकालस्थायि गरिष्ठसुखं साधयति,
 (aiōnios g166) 18 यतो वयं प्रत्यक्षान् विषयान् अनुद्दिश्याप्रत्यक्षान्
 उद्दिशामः | यतो हेतोः प्रत्यक्षविषयाः क्षणमात्रस्थायिनः किन्त्वप्रत्यक्षा
 अनन्तकालस्थायिनः | (aiōnios g166)

5 अपरम् अस्माकम् अेतस्मिन् पार्थिवे दूष्यज्ञे वेश्मनि ज्ञो सतीश्वरेण
 निर्मितम् अकरकृतम् अस्माकम् अनन्तकालस्थायि वेश्मैकं स्वर्गे विधत्
 एति वयं जानीमः | (aiōnios g166) 2 यतो हेतोरेतस्मिन् वेश्मनि तिष्ठन्तो
 वयं तं स्वर्गीयं वासं परिधातुम् आकाङ्क्षयामाणा निःश्वसामः | 3
 तथापीदानीमपि वयं तेन न नग्नाः किन्तु परिहितवसना मन्यामहे | 4
 अेतस्मिन् दूष्ये तिष्ठन्तो वयं क्लिश्यमाना निःश्वसामः, यतो वयं वासं
 त्यक्तुम् ष्छामस्तन्नहि किन्तु तं द्वितीयं वासं परिधातुम् ष्छामः,

યતસ્તથા કૃતે જીવનેન મર્ત્યં ગ્રસિષ્યતે | 5 એતદર્થં વયં યેન સૃષ્ટાઃ સ
 ઈશ્વર એવ સ યાસ્મભ્યં સત્યઙ્કારસ્ય પાણસ્વરૂપમ્ આત્માનં દત્તવાન્ | 6
 અતએવ વયં સર્વદોત્સુકા ભવામઃ કિંચ શરીરે યાવદ્ અસ્માભિ ન્યુષ્યતે
 તાવત્ પ્રભુતો દૂરે પ્રોષ્યત ઇતિ જાનીમઃ, 7 યતો વયં દૃષ્ટિમાર્ગો ન ચરામઃ
 કિન્તુ વિશ્વાસમાર્ગો | 8 અપરઞ્ચ શરીરાદ્ દૂરે પ્રવસ્તું પ્રભોઃ સન્નિઘૌ
 નિવસ્તુઞ્ચાકાઙ્કશ્યમાણા ઉત્સુકા ભવામઃ | 9 તસ્માદેવ કારણાદ્ વયં તસ્ય
 સન્નિઘૌ નિવસન્તસ્તસ્માદ્ દૂરે પ્રવસન્તો વા તસ્મૈ રોચિતું યતામહે | 10
 યસ્માત્ શરીરાવસ્થાયામ્ એકૈકેન કૃતાનાં કર્મણાં શુભાશુભફલપ્રાપ્તયે
 સર્વેસ્માભિઃ પ્રીષ્ટસ્ય વિચારાસનસમ્મુખ ઉપસ્થાતવ્યં | 11 અતએવ પ્રભો
 ભયાનકત્વં વિજ્ઞાય વયં મનુજાન્ અનુનયામઃ કિંચેશ્વરસ્ય ગોચરે સપ્રકાશા
 ભવામઃ, યુષ્માકં સંવેદગોચરેડપિ સપ્રકાશા ભવામ ઇત્યાશંસામહે | 12
 અનેન વયં યુષ્માકં સન્નિઘૌ પુનઃ સ્વાન્ પ્રશંસામ ઇતિ નહિ કિન્તુ યે મનો
 વિના મુખૈઃ શ્લાઘન્તે તેભ્યઃ પ્રત્યુત્તરદાનાય યૂયં યથાસ્માભિઃ શ્લાઘિતું
 શકન્થ તાદૃશમ્ ઉપાયં યુષ્મભ્યં વિતરામઃ | 13 યદિ વયં હતજ્ઞાના
 ભવામસ્તર્હિ તદ્ ઈશ્વરાર્થકં યદિ ય સજ્ઞાના ભવામસ્તર્હિ તદ્ યુષ્મદર્થકં |
 14 વયં પ્રીષ્ટસ્ય પ્રેમ્ના સમાકૃષ્યામહે યતઃ સર્વેષાં વિનિમયેન યદેકો
 જનોડમ્નિયત તર્હિ તે સર્વે મૃતા ઇત્યાસ્માભિ ભુંધ્યતે | 15 અપરઞ્ચ
 યે જીવન્તિ તે યત્ સ્વાર્થં ન જીવન્તિ કિન્તુ તેષાં કૃતે ચો જનો મૃતઃ
 પુનરુત્થાપિતશ્ચ તમુદ્દિશ્ય યત્ જીવન્તિ તદર્થમેવ સ સર્વેષાં કૃતે મૃતવાન્ |
 16 અતો હેતોરિતઃ પરં કોડપ્યસ્માભિ જ્ઞાતિતો ન પ્રતિજ્ઞાતવ્યઃ | યદપિ પૂર્વ
 પ્રીષ્ટો જાતિતોડસ્માભિઃ પ્રતિજ્ઞાતસ્તથાપીદાનીં જાતિતઃ પુનર્ન પ્રતિજ્ઞાયતે |
 17 કેનચિત્ પ્રીષ્ટ આશ્રિતે નૂતના સૃષ્ટિ ભવતિ પુરાતનાનિ લુપ્યન્તે પશ્ય
 નિખિલાનિ નવીનાનિ ભવન્તિ | 18 સર્વઞ્ચૈતદ્ ઈશ્વરસ્ય કર્મ યતો
 યીશુપ્રીષ્ટેન સ એવાસ્માન્ સ્વેન સાદ્ધં સંહિતવાન્ સન્ધાનસમ્બન્ધીયાં
 પરિચર્યામ્ અસ્માસુ સમર્પિતવાંશ્ચ | 19 યતઃ ઈશ્વરઃ પ્રીષ્ટમ્ અધિષ્ઠાય
 જગતો જનાનામ્ આગાંસિ તેષામ્ ઋણમિવ ન ગણયન્ સ્વેન સાદ્ધં તાન્
 સંહિતવાન્ સન્ધિવાર્તામ્ અસ્માસુ સમર્પિતવાંશ્ચ | 20 અતો વયં પ્રીષ્ટસ્ય
 વિનિમયેન દૈત્યં કર્મ સમ્પાદયામહે, ઈશ્વરશ્ચાસ્માભિ યુષ્માન્ યાયાચ્યતે
 તતઃ પ્રીષ્ટસ્ય વિનિમયેન વયં યુષ્માન્ પ્રાર્થયામહે યૂયમીશ્વરેણ સન્ધત્ |

21 यतो वयं तेन यद् ईश्वरीयपुण्यं भवामस्तदर्थं पापेन सह यस्य ज्ञातेयं
नासीत् स अवे तेनास्माकं विनिमयेन पापः कृतः ।

6 तस्य सहाया वयं युष्मान् प्रार्थयामहे, ईश्वरस्यानुग्रहो युष्माभि
र्वृथा न गृह्यतां । 2 तेनोक्तमेतत्, संश्रोष्यामि शुभे काले त्वदीयां
प्रार्थनाम् अहं । उपकारं करिष्यामि परित्राणदिने तव । पश्यतायं शुभकालः
पश्यतेहं त्राणदिनं । 3 अस्माकं परिचर्या यन्निष्कलङ्गा भवेत् तदर्थं
वयं कुत्रापि विघ्नं न जनयामः, 4 किन्तु प्रचुरसङ्घिष्णुता क्लेशो द्वैत्यं
विपत् ताडना काराबन्धनं निवासहीनत्वं परिश्रमो जागरणम् उपवसनं
5 निर्मलत्वं ज्ञानं मूढशीलता हितैषिता 6 पवित्र आत्मा निष्कपटं प्रेम
सत्यालाप ईश्वरीयशक्ति 7 ईक्ष्णिवामाभ्यां कराभ्यां धर्मास्त्रधारणं 8
मानापमानयोरभ्यातिसुभ्यात्यो र्भागित्वम् अतैः सर्व्वेरीश्वरस्य प्रशंस्यान्
परियारकान् स्वान् प्रकाशयामः । 9 भ्रमकसमा वयं सत्यवादिनो भवामः,
अपरिचितसमा वयं सुपरिचिता भवामः, मृतकल्पा वयं ज्ञवामः,
एडयमाना वयं न हन्यामहे, 10 शोकयुक्ताश्च वयं सदानन्दाभः, हरिद्रा वयं
बहुन् धनिनः कुर्मः, अकिञ्चनाश्च वयं सर्व्वं धारयामः । 11 हे करिन्धिनः,
युष्माकं प्रति ममास्थं मुक्तं ममान्तःकरणाञ्च विकसितं । 12 यूयं ममान्तरे न
सङ्गोयिताः किञ्च यूयमेव सङ्गोयितयित्ताः । 13 किन्तु मह्यं न्याय्यङ्गलदानार्थं
युष्माभिरपि विकसितै र्भवितव्यम् एत्यहं निजबालकानिव युष्मान् वदामि ।
14 अपरम् अप्रत्ययिभिः सार्द्धं यूयम् अक्युगे बद्धा मा भूत, यस्माद्
धर्माधर्मयोः कः सम्बन्धोऽस्ति? तिमिरेण सार्द्धं प्रभाया वा का तुलनास्ति?
15 बिलीयालदेवेन साकं प्रीष्टस्य वा का सन्धिः? अविश्वासिना सार्द्धं वा
विश्वासिलोकस्यांशः कः? 16 ईश्वरस्य मन्दिरेण सह वा देवप्रतिमानां का
तुलना? अमरस्येश्वरस्य मन्दिरे यूयमेव । ईश्वरेण तद्दुक्तं यथा, तेषां
मध्येऽहं स्वावासं निधास्यामि तेषां मध्ये य यातायातं कुर्व्वन् तेषाम् ईश्वरो
भविष्यामि ते य मल्लोका भविष्यन्ति । 17 अतो हतोः परमेश्वरः कथयति
यूयं तेषां मध्याद् बहिर्भूय पृथग् भवत, किमप्यमेध्यं न स्पृशत; तेनाहं
युष्मान् ग्रहीष्यामि, 18 युष्माकं पिता भविष्यामि य, यूयञ्च मम कन्यापुत्रा
भविष्यथेति सर्व्वशक्तिमता परमेश्वरेणोक्तं ।

7 અતએવ હે પ્રિયતમાઃ, એતાદૃશીઃ પ્રતિજ્ઞાઃ પ્રાપ્તૈરસ્માભિઃ શરીરાત્મનોઃ સર્વમાલિન્યમ્ અપમૃજ્યેશ્વરસ્ય ભક્ત્યા પવિત્રાચારઃ સાધ્યતાં | 2 યૂયમ્ અસ્માન્ ગૃહ્ણીત | અસ્માભિઃ કસ્યાપ્યન્યાયો ન કૃતઃ કોડપિ ન વચ્ચિતઃ | 3 યુષ્માન્ દોષિણઃ કર્તમહં વાક્યમેતદ્ વદામીતિ નહિ યુષ્માભિઃ સહ જીવનાય મરણાય વા વયં યુષ્માન્ સ્વાન્તઃકરણૌ ધારિયામ ઇતિ પૂર્વ્ય મયોક્તં | 4 યુષ્માન્ પ્રતિ મમ મહેત્સાહો જાયતે યુષ્માન્ અધ્યહં બહુ શલાઘે ચ તેન સર્વ્યકલેશસમયેડહં સાન્ત્વનયા પૂર્ણો હર્ષેણ પ્રકુલ્લિતશ્ચ ભવામિ | 5 અસ્માસુ માકિદનિયાદેશમ્ આગતેષ્વસ્માકં શરીરસ્ય કાયિદપિ શાન્તિ નાભવત્ કિન્તુ સર્વ્યતો બહિ વિરોધેનાન્તશ્ચ ભીત્યા વયમ્ અપીડયામહિ | 6 કિન્તુ નમ્રાણાં સાન્ત્વયિતા ચ ઇશ્વરઃ સ તીતસ્યાગમનેનાસ્માન્ અસાન્ત્વયત્ | 7 કેવલં તસ્યાગમનેન તન્નહિ કિન્તુ યુષ્મત્તો જાતયા તસ્ય સાન્ત્વનયાપિ, યતોડસ્માસુ યુષ્માકં હાર્દવિલાપાસકતત્વેષ્વસ્માકં સમીપે વર્ણિતેષુ મમ મહાનન્દો જાતઃ | 8 અહં પત્રેણ યુષ્માન્ શોકયુક્તાન્ કૃતવાન્ ઇત્યસ્માદ્ અન્વતપ્યે કિન્ત્વધુના નાનુતપ્યે | તેન પત્રેણ યૂયં ક્ષણમાત્રં શોકયુક્તીભૂતા ઇતિ મયા દૃશ્યતે | 9 ઇત્યસ્મિન્ યુષ્માકં શોકેનાહં હૃષ્યામિ તન્નહિ કિન્તુ મનઃપરિવર્તનાય યુષ્માકં શોકોડભવદ્ ઇત્યનેન હૃષ્યામિ યતોડસ્મત્તો યુષ્માકં કાપિ હાનિ ર્યન્ન ભવેત્ તદર્થ યુષ્માકમ્ ઇશ્વરીયઃ શોકો જાતઃ | 10 સ ઇશ્વરીયઃ શોકઃ પરિત્રાણજનકં નિરનુતાપં મનઃપરિવર્તનં સાધયતિ કિન્તુ સાંસારિકઃ શોકો મૃત્યું સાધયતિ | 11 પશ્યત તેનેશ્વરીયેણ શોકેન યુષ્માકં કિં ન સાધિતં? યત્નો દોષપ્રક્ષાલનમ્ અસન્તુષ્ટત્વં હાર્દમ્ આસકતત્વં ફલદાનઞ્ચૈતાનિ સર્વ્યાણિ | તસ્મિન્ કર્મણિ યૂયં નિર્મલા ઇતિ પ્રમાણં સર્વ્યેણ પ્રકારેણ યુષ્માભિ દત્તં | 12 યેનાપરાદ્ધં તસ્ય કૃતે કિંવા યસ્યાપરાદ્ધં તસ્ય કૃતે મયા પત્રમ્ અલેખિ તન્નહિ કિન્તુ યુષ્માનધ્યસ્માકં યત્નો યદ્ ઇશ્વરસ્ય સાક્ષાદ્ યુષ્મત્સમીપે પ્રકાશેત તદર્થમેવ | 13 ઉક્તકારણાદ્ વયં સાન્ત્વનાં પ્રાપ્તાઃ; તાઞ્ચ સાન્ત્વનાં વિનાવરો મહાહ્વાદસ્તીતસ્યાહ્વાદાદસ્માભિ લબ્ધઃ, યતસ્તસ્યાત્મા સર્વ્યે યુષ્માભિસ્તૃપ્તઃ | 14 પૂર્વ્ય તસ્ય સમીપેડહં યુષ્માભિર્યદ્ અશલાઘે તેન નાલજ્જે કિન્તુ વયં યદ્દદ્ યુષ્માન્ પ્રતિ સત્યભાવેન સકલમ્ અભાષામહિ તદ્દત્ તીતસ્ય સમીપેડસ્માકં શલાઘનમપિ સત્યં જાતં | 15 યૂયં કીદૃક્

તસ્યાજ્ઞા અપાલયત ભયકમ્પાભ્યાં તં ગૃહીતવન્તશ્ચૈતસ્ય સ્મરણાદ્ યુષ્માસુ
તસ્ય સ્નેહો બાહુલ્યેન વર્ત્તે | 16 યુષ્માસ્વહં સર્વમાશંસે, ઇત્યસ્મિન્
મમાહ્વાદો જાયતે |

8 હે ભ્રાતરઃ, માકિદનિયાદેશસ્થાસુ સમિતિષુ પ્રકાશિતો ય
ઇશ્વરસ્થાનુગ્રહસ્તમહં યુષ્માન્ જ્ઞાપયામિ | 2 વસ્તુતો
બહુકલેશપરીક્ષાસમયે તેષાં મહાનન્દોડતીવદીનતા ય વદાન્યતાયાઃ
પ્રચુરફલમ્ અફલયતાં | 3 તે સ્વેચ્છયા યથાશક્તિ કિઞ્ચાતિશક્તિ દાન
ઉધુક્તા અભવન્ ઇતિ મયા પ્રમાણીક્રિયતે | 4 વયઞ્ચ યત્
પવિત્રલોકેભ્યસ્તેષાં દાનમ્ ઉપકારાર્થકમ્ અંશનઞ્ચ ગૃહ્ણામસ્તદ્
બહુનુનયેનાસ્માન્ પ્રાર્થિતવન્તઃ | 5 વયં યાદૃક્ પ્રત્યૈક્ષામહિ તાદૃગ્ અકૃત્વા
તેડગ્રે પ્રભવે તતઃ પરમ્ ઇશ્વરસ્યેચ્છયાસ્મભ્યમપિ સ્વાન્ ન્યવેદયન્ | 6
અતો હેતોસ્ત્વં યથારબ્ધવાન્ તથૈવ કરિન્થિનાં મધ્યેડપિ તદ્ દાનગ્રહણં
સાધયેતિ યુષ્માન્ અધિ વયં તીતં પ્રાર્થયામહિ | 7 અતો વિશ્વાસો
વાકપટુતા જ્ઞાનં સર્વોત્સાહો ડસ્માસુ પ્રેમ ચૈતૈ ગુણૈ રૂપં યથાપરાન્
અતિશેઘ્વે તથૈવૈતેન ગુણેનાપ્યતિશેઘ્વં | 8 એતદ્ અહમ્ આજ્ઞયા
કથયામીતિ નહિ કિન્ત્વન્યેષામ્ ઉત્સાહકારણાદ્ યુષ્માકમપિ પ્રેમ્નઃ સારલ્યં
પરીક્ષિતુમિચ્છતા મયૈતત્ કથ્યતે | 9 યૂયઞ્ચાસ્મત્રભો ર્યોશુબ્રીષ્થસ્થાનુગ્રહં
જાનીથ યતસ્તસ્ય નિર્ધનત્વેન યૂયં યદ્ ધનિનો ભવથ તદર્થં સ ધની સન્નપિ
યુષ્મત્કૃતે નિર્ધનોડભવત્ | 10 એતસ્મિન્ અહં યુષ્માન્ સ્વવિચારં
જ્ઞાપયામિ | ગતં સંવત્સરમ્ આરભ્ય યૂયં કેવલં કર્મ કર્ત્તં તન્નહિ
કિન્ત્વચ્છુકતાં પ્રકાશયિતુમપ્યુપાક્રાભ્યધ્વં તતો હેતો યુષ્મત્કૃતે મમ મન્ત્રણા
ભદ્રા | 11 અતો ડધુના તત્કર્મસાધનં યુષ્માભિઃ ક્રિયતાં તેન યદ્દદ્
ઇચ્છુકતાયામ્ ઉત્સાહસ્તદ્દદ્ એકૈકસ્ય સમ્પદનુસારેણ કર્મસાધનમ્ અપિ
જનિષ્યતે | 12 યસ્મિન્ ઇચ્છુકતા વિધતે તેન યન્ન ધાર્યતે તસ્માત્
સોડનુગૃહ્યત ઇતિ નહિ કિન્તુ યદ્ ધાર્યતે તસ્માદેવ | 13 યત ઇતરેષાં
વિરામોણ યુષ્માકઞ્ચ કલેશેન ભવિતવ્યં તન્નહિ કિન્તુ સમતથૈવ | 14
વર્ત્તમાનસમયે યુષ્માકં ધનાધિક્યેન તેષાં ધનન્યૂનતા પૂરયિતવ્યા તસ્માત્
તેષામપ્યાધિક્યેન યુષ્માકં ન્યૂનતા પૂરયિષ્યતે તેન સમતા જનિષ્યતે | 15
તદેવ શાસ્ત્રેડપિ લિખિતમ્ આસ્તે યથા, યેનાધિકં સંગૃહીતં તસ્યાધિકં

નાભવત્ એન ચાલ્પં સંગૃહીતં તસ્યાલ્પં નાભવત્ | 16 યુષ્માકં હિતાય
 તીતસ્ય મનસિ ય ઈશ્વર ઇમમ્ ઉધોગં જનિતવાન્ સ ધન્યો ભવતુ | 17
 તીતોડસ્માકં પ્રાર્થનાં ગૃહીતવાન્ કિઞ્ચ સ્વયમ્ ઉધુક્તઃ સન્ સ્વેચ્છયા
 યુષ્મત્સમીપં ગતવાન્ | 18 તેન સહ ચોડપર એકો બ્રાતાસ્માભિઃ પ્રેષિતઃ
 સુસંવાદાત્ તસ્ય સુખ્યાત્યા સર્વાઃ સમિતયો વ્યાપ્તાઃ | 19 પ્રભો ગૌરવાય
 યુષ્માકમ્ ઇચ્છુકતાયૈ ય સ સમિતિભિરેતસ્યૈ દાનસેવાયૈ અસ્માકં સક્ષિત્વે
 ન્યયોજ્યત | 20 યતો યા મહોપાયનસેવાસ્માભિ વિધીયતે તામધિ વયં યત્
 કેનાપિ ન નિન્ધામહે તદર્થં યતામહે | 21 યતઃ કેવલં પ્રભોઃ સાક્ષાત્ તન્નહિ
 કિન્તુ માનવાનામપિ સાક્ષાત્ સદાચારં કર્તુમ્ આલોચામહે | 22 તાભ્યાં
 સહાપર એકો ચો બ્રાતાસ્માભિઃ પ્રેષિતઃ સોડસ્માભિ ભંદુવિષયેષુ બહવારાન્
 પરીક્ષિત ઉધોગીવ પ્રકાશિતશ્ચ કિન્ત્વધુના યુષ્માસુ દૃઢવિશ્વાસાત્
 તસ્યોત્સાહો બહુ વવૃધે | 23 યદિ કશ્ચિત્ તીતસ્ય તત્ત્વં જિજ્ઞાસતે તર્હિ સ
 મમ સહભાગી યુષ્મન્મધ્યે સહકારી ય, અપરયો ભ્રાત્રોસ્તત્ત્વં વા યદિ
 જિજ્ઞાસતે તર્હિ તૌ સમિતીનાં દૂતૌ ખ્રીષ્ટસ્ય પ્રતિબિમ્બૌ ચેતિ તેન જ્ઞાયતાં |
 24 અતો હેતોઃ સમિતીનાં સમક્ષં યુષ્મત્રેભ્નોડસ્માકં શલાઘાયાશ્ચ પ્રામાણ્યં
 તાન્ પ્રતિ યુષ્માભિઃ પ્રકાશયિતવ્યં |

9 પવિત્રલોકાનામ્ ઉપકારાર્થકસેવામધિ યુષ્માન્ પ્રતિ મમ લિખનં
 નિષ્પ્રયોજનં | 2 યત આખ્યાયાદેશસ્થા લોકા ગતવર્ષમ્ આરભ્ય તત્કાર્ય
 ઉધતાઃ સન્તીતિ વાક્યેનાહં માકિદનીયલોકાનાં સમીપે યુષ્માકં યામ્
 ઇચ્છુકતામધિ શલાઘે તામ્ અવગતોડસ્મિ યુષ્માકં તસ્માદ્ ઉત્સાહાચ્યાપરેષાં
 બહૂનામ્ ઉધોગો જાતઃ | 3 કિઞ્ચૈતસ્મિન્ યુષ્માન્ અધ્યસ્માકં શલાઘા
 યદ્ અતથ્યા ન ભવેત્ યૂયઞ્ચ મમ વાક્યાનુસારાદ્ યદ્ ઉધતાસ્તિષ્ઠેત
 તદર્થમેવ તે ભ્રાતરો મયા પ્રેષિતાઃ | 4 યસ્માત્ મયા સાર્દ્ધં કૈશ્ચિત્
 માકિદનીયબ્રાતૃભિરાગત્ય યૂયમનુધતા ઇતિ યદિ દૃશ્યતે તર્હિ તસ્માદ્
 દૃઢવિશ્વાસાદ્ યુષ્માકં લજ્જા જનિષ્યત ઇત્યસ્માભિ ન વક્તવ્યં
 કિન્ત્વસ્માકમેવ લજ્જા જનિષ્યતે | 5 અતઃ પ્રાક્ પ્રતિજ્ઞાતં યુષ્માકં દાનં
 યત્ સન્નિતં ભવેત્ તસ્ય યદ્ ગ્રાહકતાયાઃ ફલમ્ અભૂત્વા દાનશીલતાયા
 એવ ફલં ભવેત્ તદર્થં મમાગ્રે ગમનાય તત્સન્નયનાય ય તાન્ ભ્રાતૃન્
 આદેષ્ટમહં પ્રયોજનમ્ અમન્યે | 6 અપરમપિ વ્યાહરામિ કેનચિત્ ક્ષુદ્રભાવેન

બીજેષૂપ્તેષુ સ્વલ્પાનિ શસ્યાનિ કર્તિષ્યન્તે, કિંચ કેનચિદ્ બહુદભવેન
બીજેષૂપ્તેષુ બહૂનિ શસ્યાનિ કર્તિષ્યન્તે | 7 એકૈકેન સ્વમનસિ યથા
નિશ્ચીયતે તથૈવ દીયતાં કેનાપિ કાતરેણ ભીતેન વા ન દીયતાં યત ઈશ્વરો
હૃષ્ટમાનસે દાતરિ પ્રીયતે | 8 અપરમ્ ઈશ્વરો યુષ્માન્ પ્રતિ સર્વવિધં
બહુપ્રદં પ્રસાદં પ્રકાશયિતુમ્ અર્હતિ તેન યૂયં સર્વવિષયે યથેષ્ટં પ્રાપ્ય
સર્વોણ સત્કર્માણા બહુફલવન્તો ભવિષ્યથ | 9 એતસ્મિન્ લિખિતમાસ્તે,
યથા, વ્યયતે સ જનો રાયં દુર્ગતેભ્યો દદાતિ ચ | નિત્યસ્થાયી ચ તદ્ધર્મઃ
(aīōn g165) 10 બીજં ભેજનીયમ્ અન્નઞ્ચ વપ્ત્રે યેન વિશ્રાણ્યતે સ
યુષ્મભ્યમ્ અપિ બીજં વિશ્રાણ્ય બહુલીકરિષ્યતિ યુષ્માકં ધર્મફલાનિ
વર્દ્ધયિષ્યતિ ચ | 11 તેન સર્વવિષયે સધનીભૂતૈ યુષ્માભિઃ સર્વવિષયે
દાનશીલતાયાં પ્રકાશિતાયામ્ અસ્માભિરીશ્વરસ્ય ધન્યવાદઃ સાધયિષ્યતે |
12 એતયોપકારસેવયા પવિત્રલોકાનામ્ અર્થાભાવસ્ય પ્રતીકારો જાયત
ઇતિ કેવલં નહિ કિન્ત્વીશ્વરસ્ય ધન્યવાદોડપિ બાહુલ્યેનોત્પાદતે | 13
યત એતસ્માદ્ ઉપકારકરણાદ્ યુષ્માકં પરીક્ષિતત્વં બુદ્ધ્યા બહુભિઃ
પ્રીષ્ટસુસંવાદાઙ્ગીકરણે યુષ્માકમ્ આજ્ઞાગ્રાહિત્વાત્ તદ્ભાગિત્વે ચ તાન્
અપરાંશ્ચ પ્રતિ યુષ્માકં દાતૃત્વાદ્ ઈશ્વરસ્ય ધન્યવાદઃ કારિષ્યતે, 14
યુષ્મદર્થં પ્રાર્થનાં કૃત્વા ચ યુષ્માસ્વીશ્વરસ્ય ગરિષ્ઠાનુગ્રહાદ્ યુષ્માસુ તૈઃ પ્રેમ
કારિષ્યતે | 15 અપરમ્ ઈશ્વરસ્યાનિર્વ્યયનીયદાનાત્ સ ધન્યો ભૂયાત્ |

10 યુષ્મત્પ્રત્યક્ષે નમ્રઃ કિન્તુ પરોક્ષે પ્રગલ્ભઃ પૌલોડહં પ્રીષ્ટસ્ય ક્ષાન્ત્યા
વિનીત્યા ચ યુષ્માન્ પ્રાર્થયે | 2 મમ પ્રાર્થનીયમિદં વયં ચૈઃ શારીરિકાચારિણો
મન્યામહે તાન્ પ્રતિ યાં પ્રગલ્ભતાં પ્રકાશયિતું નિશ્ચિનોમિ સા પ્રગલ્ભતા
સમાગતેન મયાચરિતવ્યા ન ભવતુ | 3 યતઃ શરીરે ચરન્તોડપિ વયં શારીરિકં
યુદ્ધં ન કુર્મઃ | 4 અસ્માકં યુદ્ધાસ્ત્રાણિ ચ ન શારીરિકાનિ કિન્ત્વીશ્વરેણ
દુર્ગભઞ્જનાય પ્રબલાનિ ભવન્તિ, 5 તૈશ્ચ વયં વિતર્કાન્ ઈશ્વરીયતત્ત્વજ્ઞાનસ્ય
પ્રતિબન્ધિકાં સર્વાં ચિત્તસમુન્નતિઞ્ચ નિપાતયામઃ સર્વસકુલ્પઞ્ચ બન્દિનં
કૃત્વા પ્રીષ્ટસ્યાજ્ઞાગ્રાહિણં કુર્મઃ, 6 યુષ્માકમ્ આજ્ઞાગ્રાહિત્વે સિદ્ધે સતિ
સર્વસ્યાજ્ઞાલક્ષ્ણસ્ય પ્રતીકારં કર્તુમ્ ઉદ્યતા આસ્મહે ચ | 7 યદ્ દૃષ્ટિગોચરં
તદ્ યુષ્માભિ દૃશ્યતાં | અહં પ્રીષ્ટસ્ય લોક ઇતિ સ્વમનસિ યેન વિજ્ઞાયતે સ
યથા પ્રીષ્ટસ્ય ભવતિ વયમ્ અપિ તથા પ્રીષ્ટસ્ય ભવામ ઇતિ પુનર્વિવિચ્ય

तेन बुध्यतां | 8 युष्माकं निपाताय तन्नहि किन्तु निष्ठाये प्रभुना दत्तं यदस्माकं सामर्थ्यं तेन यद्यपि किञ्चिद् अधिकं श्लाघे तथापि तस्मान्ना त्रिष्ये | 9 अहं पत्रै र्युष्मान् त्रासयामि युष्माभिरेतन्न मन्यतां | 10 तस्य पत्राणि गुरुतराणि प्रबलानि य भवन्ति किन्तु तस्य शारीरसाक्षात्कारो दुर्बल आलापश्च तुच्छनीय एति कैश्चिद् उच्यते | 11 किन्तु परोक्षे पत्रै र्भाषिमाणा वयं यादृशाः प्रकाशामहे प्रत्यक्षे कर्म कुर्वन्तोऽपि तादृशा अेव प्रकाशिष्यामहे तत् तादृशेन वायालेन ज्ञायतां | 12 स्वप्रशंसकानां केषाञ्चिन्मध्ये स्वान् गणयितुं तैः स्वान् उपमातुं वा वयं प्रगल्भा न भवामः, यतस्ते स्वपरिमाणेन स्वान् परिमिते स्वैश्च स्वान् उपमिते तस्मात् निर्वर्द्धा भवन्ति य | 13 वयम् अपरिमितेन न श्लाघिष्यामहे किन्तु श्वरेण स्वस्वजा युष्मद्देशगामि यत् परिमाणम् अस्मदर्थं निरूपितं तेनैव श्लाघिष्यामहे | 14 युष्माकं देशोऽस्माभिरगन्तव्यस्तस्माद् वयं स्वसीमाम् उल्लङ्घामहे तन्नहि यतः श्रीष्टस्य सुसंवादेनापरेषां प्राग् वयमेव युष्मान् प्राप्तवन्तः | 15 वयं स्वसीमाम् उल्लङ्घ्य परक्षेत्रेण श्लाघामहे तन्नहि, किञ्च युष्माकं विश्वासे वृद्धिं गते युष्मद्देशोऽस्माकं सीमा युष्माभिर्दीर्घं विस्तारयिष्यते, 16 तेन वयं युष्माकं पश्चिमदिक्स्थेषु स्थानेषु सुसंवादे घोषयिष्यामः, एत्थं परसीमायां परेण यत् परिष्कृतं तेन न श्लाघिष्यामहे | 17 यः कश्चित् श्लाघमानः स्यात् श्लाघतां प्रभुना स हि | 18 स्वेन यः प्रशंस्यते स परीक्षितो नहि किन्तु प्रभुना यः प्रशंस्यते स अेव परीक्षितः |

11 यूयं ममाज्ञानतां क्षाणं यावत् सोढुम् अर्हथ, अतः सा युष्माभिः सह्यतां | 2 एश्वरे ममासक्तत्वाद् अहं युष्मानधि तपे यस्मात् सतीं कन्यामिव युष्मान् अेकस्मिन् वरेऽर्थतः श्रीष्टे समर्पयितुम् अहं वाग्दानम् अकार्षं | 3 किन्तु सर्पोण स्वभलतया यद्दद् एवा वञ्चयाञ्चके तद्दत्तं श्रीष्टं प्रति सतीत्वाद् युष्माकं भ्रंशः सम्भविष्यतीति विभेमि | 4 अस्माभिरनाभ्यापितोऽपरः कश्चिद् यीशु र्यदि केनयिद् आगन्तुकेनाभ्याप्यते युष्माभिः प्रागलब्ध आत्मा वा यदि लभ्यते प्रागगृहीतः सुसंवादे वा यदि गृह्यते तर्हि मन्ये यूयं सम्यक् सहिष्यध्वे | 5 किन्तु मुष्येत्यः प्रेरितेत्योऽहं केनयित् प्रकाशेण न्यूनो नास्मीति बुध्ये | 6 मम वाक्पटुताया न्यूनत्वे सत्यपि

જ્ઞાનસ્ય ન્યૂનત્વં નાસ્તિ કિન્તુ સર્વવિષયે વયં યુષ્મદ્ગોચરે પ્રકાશામહે |
 7 યુષ્માકમ્ ઉન્નત્યૈ મયા નમ્રતાં સ્વીકૃત્યેશ્વરસ્ય સુસંવાદો વિના વેતનં
 યુષ્માકં મધ્યે યદ્ અઘોષ્યત તેન મયા કિં પાપમ્ અકારિ? 8 યુષ્માકં
 સેવનાયાહમ્ અન્યસમિતિભ્યો ભૃતિ ગૃહ્ણન્ ધનમપહતવાન, 9 યદા ચ
 યુષ્મન્મધ્યેડવડર્તે તદા મમાર્થાભાવે જાતે યુષ્માકં કોડપિ મયા ન પીડિતઃ;
 યતો મમ સોડર્થાભાવો માકિદનિયાદેશાદ્ આગતૈ ભ્રાતૃભિ ન્યવાચ્યત,
 ઇત્યમહં ક્કાપિ વિષયે યથા યુષ્માસુ ભારો ન ભવામિ તથા મયાત્મરક્ષા
 કૃતા કર્તવ્યા ચ | 10 ખ્રીષ્ટસ્ય સત્યતા યદિ મયિ તિષ્ઠતિ તર્હિ મમૈષા શ્લાઘા
 નિખિલાખાયાદેશે કેનાપિ ન રોત્સ્યતે | 11 એતસ્ય કારણં કિં? યુષ્માસુ મમ
 પ્રેમ નાસ્ત્યેતત્ કિં તત્કારણં? તદ્ ઇશ્વરો વેત્તિ | 12 યે છિદ્રમન્વિષ્યન્તિ
 તે યત્ કિમપિ છિદ્રં ન લભન્તે તદર્થમેવ તત્ કર્મ્ મયા ક્રિયતે કારિષ્યતે
 ચ તસ્માત્ તે યેન શ્લાઘન્તે તેનાસ્માકં સમાના ભવિષ્યન્તિ | 13 તાદૃશા
 ભાક્તપ્રેરિતાઃ પ્રવચ્ચકાઃ કારવો ભૂત્વા ખ્રીષ્ટસ્ય પ્રેરિતાનાં વેશં ધારયન્તિ |
 14 તચ્ચાશ્રચ્ચૈ નહિ; યતઃ સ્વયં શયતાનપિ તેજસ્વિદૂતસ્ય વેશં ધારયતિ,
 15 તતસ્તસ્ય પરિચારકા અપિ ધર્મપરિચારકાણાં વેશં ધારયન્તીત્યદ્ભુતં
 નહિ; કિન્તુ તેષાં કર્મ્માણિ યાદૃશાનિ ફલાન્યપિ તાદૃશાનિ ભવિષ્યન્તિ | 16
 અહં પુનર્વદામિ કોડપિ માં નિબ્બોધં ન મન્યતાં કિન્તુ યદપિ નિબ્બોધો
 ભવેયં તથાપિ યૂયં નિબ્બોધમિવ મામનુગૃહ્ય ક્ષણૈકં યાવત્ મમાત્મશ્લાઘામ્
 અનુજાનીત | 17 એતસ્યાઃ શ્લાઘાયા નિમિત્તં મયા યત્ કથિતવ્યં તત્
 પ્રભુનાદિષ્ટેનેવ કથ્યતે તન્નહિ કિન્તુ નિબ્બોધેનેવ | 18 અપરે બહવઃ
 શારીરિકશ્લાઘાં કુર્વતે તસ્માદ્ અહમપિ શ્લાઘિષ્યે | 19 બુદ્ધિમન્તો યૂયં
 સુખેન નિબ્બોધાનામ્ આચારં સહધ્વે | 20 કોડપિ યદિ યુષ્માન્ દાસાન્ કરોતિ
 યદિ વા યુષ્માકં સર્વસ્વં ગ્રસતિ યદિ વા યુષ્માન્ હરતિ યદિ વાત્માભિમાની
 ભવતિ યદિ વા યુષ્માકં કપોલમ્ આહન્તિ તર્હિ તદપિ યૂયં સહધ્વે | 21
 દૌર્બ્બલ્યાદ્ યુષ્માભિરવમાનિતા ઇવ વયં ભાષામહે, કિન્તવપરસ્ય કસ્યચિદ્
 યેન પ્રગલ્ભતા જાયતે તેન મમાપિ પ્રગલ્ભતા જાયત ઇતિ નિબ્બોધેનેવ મયા
 વક્તવ્યં | 22 તે કિમ્ ઇબ્રિલોકાઃ? અહમપીબ્રી | તે કિમ્ ઇસ્રાયેલીયાઃ?
 અહમપીસ્રાયેલીયાઃ | તે કિમ્ ઇબ્રાહીમો વંશાઃ? અહમપીબ્રાહીમો વંશઃ |
 23 તે કિં ખ્રીષ્ટસ્ય પરિચારકાઃ? અહં તેભ્યોડપિ તસ્ય મહાપરિચારકઃ;

કિન્તુ નિબ્બોધ ઇવ ભાષે, તેભ્યોડપ્યહં બહુપરિશ્રમે બહુપ્રહારે બહુવારં
કારાયાં બહુવારં પ્રાણનાશસંશયે ચ પતિતવાન્ | 24 ચિહ્નૈયૈરહં
પત્તકૃત્વ ઊન્યત્વારિશત્પ્રહારૈરાહતસ્ત્રિવેત્રાઘાતમ્ એકકૃત્વઃ પ્રસ્તરાઘાતઞ્ચ
પ્રપ્તવાન્ | 25 વારત્રયં પોતભઞ્જનેન કિલિષ્ટોડહમ્ અગાધસલિલે દિનમેકં
રાત્રિમેકાઞ્ચ યાપિતવાન્ | 26 બહુવારં યાત્રાભિ નદીનાં સહુટૈ દ્વૈસ્યૂનાં સહુટૈઃ
સ્વજાતીયાનાં સહુટૈ ભિન્નજાતીયાનાં સહુટૈ નગરસ્ય સહુટૈ મરુભૂમેઃ સહુટૈ
સાગરસ્ય સહુટૈ ભાકિત્ત્રાતૃણાં સહુટૈશ્ચ 27 પરિશ્રમકલેશાભ્યાં વારં વારં
જાગરણેન ક્ષુધાતૃષ્ણાભ્યાં બહુવારં નિરાહારેણ શીતનગ્નતાભ્યાઞ્ચાહં
કાલં યાપિતવાન્ | 28 તાદૃશં નૈમિત્તિકં દુઃખં વિનાહં પ્રતિદિનમ્ આકુલો
ભવામિ સર્વાસાં સમિતીનાં ચિન્તા ચ મયિ વર્તતે | 29 યેનાહં ન
દુર્બલભવામિ તાદૃશં દૌર્બલ્યં કઃ પાપ્નોતિ? 30 યદિ મયા શ્લાઘિતવ્યં
તર્હિ સ્વદુર્બલતામધિ શ્લાઘિષ્યે | 31 મયા મૃષાવાક્યં ન કથ્યત ઇતિ
નિત્યં પ્રશંસનીયોડસ્માકં પ્રભો ર્યોશુષ્રીષ્ટસ્ય તાત ઇશ્વરો જાનાતિ |
(aīōn g165) 32 દમ્ભેષકનગરેડરિતારાજસ્ય કાર્ય્યાધ્યક્ષો માં ધર્તુમ્ ઇચ્છન્
યદા સૈન્યૈસ્તદ્ દમ્ભેષકનગરમ્ અરક્ષયત્ 33 તદાહં લોકેઃ પિટકમધ્યે
પ્રાચીરગવાક્ષેણાવરોહિતસ્તસ્ય કરાત્ ત્રાણં પ્રાપં |

12 આત્મશ્લાઘા મમાનુપયુક્તા કિન્ત્વહં પ્રભો દર્શનાદેશાનામ્ આખ્યાનં
કથયિતું પ્રવર્તે | 2 ઇતઞ્ચતુર્દશવત્સરેભ્યઃ પૂર્વં મયા પરિચિત એકો
જનસ્તૃતીયં સ્વર્ગમનીયત, સ સશરીરેણ નિઃશરીરેણ વા તત્ સ્થાનમનીયત
તદહં ન જાનામિ કિન્ત્વીશ્વરો જાનાતિ | 3 સ માનવઃ સ્વર્ગં નીતઃ સન્
અકથ્યાનિ મર્ત્યવાગતીતાનિ ચ વાક્યાનિ શ્રુતવાન્ | 4 કિન્તુ તદાનીં સ
સશરીરો નિઃશરીરો વાસીત્ તન્મયા ન જ્ઞાયતે તદ્ ઇશ્વરેણૈવ જ્ઞાયતે |
5 તમધ્યહં શ્લાઘિષ્યે મામધિ નાન્યેન કેનચિદ્ વિષયેણ શ્લાઘિષ્યે કેવલં
સ્વદૌર્બલ્યેન શ્લાઘિષ્યે | 6 યદહમ્ આત્મશ્લાઘાં કર્તુમ્ ઇચ્છેયં તથાપિ
નિબ્બોધ ઇવ ન ભવિષ્યામિ યતઃ સત્યમેવ કથયિષ્યામિ, કિન્તુ લોકા માં
યાદૃશં પશ્યન્તિ મમ વાક્યં શ્રુત્વા વા યાદૃશં માં મન્યતે તસ્માત્ શ્રેષ્ઠં માં
યન્ન ગણયન્તિ તદર્થમહં તતો વિરંસ્યામિ | 7 અપરમ્ ઉત્કૃષ્ટદર્શનપ્રાપ્તિતો
યદહમ્ આત્માભિમાની ન ભવામિ તદર્થં શરીરવેધકમ્ એકં શૂલં મહ્યમ્
અદાધિ તત્ મદીયાત્માભિમાનનિવારણાર્થં મમ તાડયિતા શયતાનો

દૂતઃ | 8 મત્તસ્તસ્ય પ્રસ્થાનં યાયિતુમહં ત્રિસ્તમધિ પ્રભુમુદ્દિશ્ય પ્રાર્થનાં
 કૃતવાન્ | 9 તતઃ સ મામુક્તવાન્ મમાનુગ્રહસ્તવ સર્વ્વસાધકઃ, યતો
 દૌર્બ્બલ્યાત્ મમ શક્તિઃ પૂર્ણતાં ગચ્છતીતિ | અતઃ પ્રીષ્ટસ્ય શક્તિ ર્ચન્મામ્
 આશ્રયતિ તદર્થં સ્વદૌર્બ્બલ્યેન મમ શલાઘનં સુખદં | 10 તસ્માત્ પ્રીષ્ટહેતો
 દૌર્બ્બલ્યનિન્દાદરિદ્રતાવિપક્ષતાકષ્ટાદિષુ સન્તુષ્યામ્યહં | યદાહં દુર્બ્બલોડસ્મિ
 તદૈવ સબલો ભવામિ | 11 એતેનાત્મશલાઘનેનાહં નિર્બ્બોધ ઇવાભવં
 કિન્તુ યૂયં તસ્ય કારણં યતો મમ પ્રશંસા યુષ્માભિરેવ કર્તવ્યાસીત્ |
 યદાપ્યમ્ અગણ્યો ભવેયં તથાપિ મુખ્યતમેભ્યઃ પ્રેરિતેભ્યઃ કેનાપિ પ્રકારેણ
 નાહં ન્યૂનોડસ્મિ | 12 સર્વ્વથાદ્ભુતક્રિયાશક્તિલક્ષણૈઃ પ્રેરિતસ્ય ચિહ્નાનિ
 યુષ્માકં મધ્યે સઘૈર્યં મયા પ્રકાશિતાનિ | 13 મમ પાલનાર્થં યૂયં મયા
 ભારાકાન્તા નાભવતૈતદ્ એકં ન્યૂનત્વં વિનાપરાભ્યઃ સમિતિભ્યો યુષ્માકં
 કિં ન્યૂનત્વં જાતં? અનેન મમ દોષં ક્ષમધ્વં | 14 પશ્યત તૃતીયવારં
 યુષ્મત્સમીપં ગન્તુમુદ્ધતોડસ્મિ તત્રાપ્યહં યુષ્માન્ ભારાકાન્તાન્ ન કરિષ્યામિ |
 યુષ્માકં સમ્પત્તિમહં ન મૃગયે કિન્તુ યુષ્માનેવ, યતઃ પિત્રોઃ કૃતે સન્તાનાનાં
 ધનસઞ્ચયોડનુપયુક્તઃ કિન્તુ સન્તાનાનાં કૃતે પિત્રો ધનસઞ્ચય ઉપયુક્તઃ |
 15 અપરઞ્ચ યુષ્માસુ બહુ પ્રીયમાણોડપ્યહં યદિ યુષ્મત્તોડલ્પં પ્રમ લભે
 તથાપિ યુષ્માકં પ્રાણરક્ષાર્થં સાનન્દં બહુ વ્યયં સર્વ્વવ્યયઞ્ચ કરિષ્યામિ | 16
 યૂયં મયા કિન્ચિદપિ ન ભારાકાન્તા ઇતિ સત્યં, કિન્ત્વહં ધૂર્તઃ સન્ છલેન
 યુષ્માન્ વઞ્ચિતવાન્ એતત્ કિં કેનચિદ્ વક્તવ્યં? 17 યુષ્મત્સમીપં મયા
 યે લોકાઃ પ્રહિતાસ્તેષામેકેન કિં મમ કોડપ્યર્થલાભો જાતઃ? 18 અહં તીતં
 વિનીય તેન સાદ્ધ્વં ભ્રાતરમેકં પ્રેષિતવાન્ યુષ્મત્તસ્તીતેન કિમ્ અર્થો લબ્ધઃ?
 એકસ્મિન્ ભાવ એકસ્ય પદચિહ્નેષુ યાવાં કિં ન ચરિતવન્તૌ? 19 યુષ્માકં
 સમીપે વયં પુન દોષક્ષાલનકથાં કથયામ ઇતિ કિં બુધ્ધ્યઘ્વે? હે પ્રિયતમાઃ,
 યુષ્માકં નિષ્ઠાર્થં વયમીશ્વરસ્ય સમક્ષં પ્રીષ્ટેન સર્વ્વાણ્યેતાનિ કથયામઃ |
 20 અહં યદાગમિષ્યામિ, તદા યુષ્માન્ યાદૃશાન્ દ્રષ્ટું નેચ્છામિ તાદૃશાન્
 દ્રક્ષ્યામિ, યૂયમપિ માં યાદૃશં દ્રષ્ટું નેચ્છથ તાદૃશં દ્રક્ષ્યથ, યુષ્મન્મધ્યે વિવાદ
 ઈર્ષ્યા ક્રોધો વિપક્ષતા પરાપવાદઃ કર્ણજપનં દર્પઃ કલહશ્ચૈતે ભવિષ્યન્તિ; 21
 તેનાહં યુષ્મત્સમીપં પુનરાગત્ય મદીયેશ્વરેણ નમચિષ્યે, પૂર્વ્વં કૃતપાપાન્

લોકાન્ સ્વીયાશુચિતાવેશ્યાગમનલમ્પટતાચરણાદ્ અનુતાપમ્ અકૃતવન્તો
દૃષ્ટ્વા ચ તાનધિ મમ શોકો જનિષ્યત ઇતિ બિભેમિ|

13 એતત્તૃતીયવારમ્ અહં યુષ્મત્સમીપં ગચ્છામિ તેન સર્વા કથા
દ્વયોસ્ત્રયાણાં વા સાક્ષિણાં મુખેન નિશ્ચોષ્યતે| 2 પૂર્વં યે
કૃતપાપાસ્તેભ્યોઽન્યેભ્યશ્ચ સર્વેભ્યો મયા પૂર્વં કથિતં, પુનરપિ
વિધમાનેનેવેદાનીમ્ અવિધમાનેન મયા કથ્યતે, યદા પુનરાગમિષ્યામિ તદાહં
ન ક્ષમિષ્યે| 3 ખ્રીષ્ટો મયા કથાં કથયત્યેતસ્ય પ્રમાણં યૂયં મૃગયધ્વે,
સ તુ યુષ્માન્ પ્રતિ દુર્બલો નહિ કિન્તુ સબલ એવ| 4 યદપિ સ
દુર્બલતયા કુશ આરોપ્યતા તથાપીશ્વરીયશક્તયા જીવતિ; વયમપિ તસ્મિન્
દુર્બલા ભવામઃ, તથાપિ યુષ્માન્ પ્રતિ પ્રકાશિતયેશ્વરીયશક્ત્યા તેન સહ
જીવિષ્યામઃ| 5 અતો યૂયં વિશ્વાસયુક્તા આધ્વે ન વેતિ જ્ઞાતુમાત્મપરીક્ષાં
કુરુધ્વં સ્વાનેવાનુસન્ધત્| યીશુઃ ખ્રીષ્ટો યુષ્મન્મધ્યે વિધતે સ્વાનધિ તત્ કિં
ન પ્રતિજાનીથ? તસ્મિન્ અવિધમાને યૂયં નિષ્પ્રમાણા ભવથ| 6 કિન્તુ વયં
નિષ્પ્રમાણા ન ભવામ ઇતિ યુષ્માભિ ભોત્સ્યતે તત્ર મમ પ્રત્યાશા જાયતે|
7 યૂયં કિમપિ કુત્સિતં કર્મ્મ યન્ન કુરુથ તદહમ્ ઇશ્વરમુદ્દિશ્ય પ્રાર્થયે| વયં
યત્ પ્રામાણિકા ઇવ પ્રકાશામહે તદર્થં તત્ પ્રાર્થયામહ ઇતિ નહિ, કિન્તુ
યૂયં યત્ સદાચારં કુરુથ વયઞ્ચ નિષ્પ્રમાણા ઇવ ભવામસ્તદર્થં| 8 યતઃ
સત્યતાયા વિપક્ષતાં કર્તું વયં ન સમર્થાઃ કિન્તુ સત્યતાયાઃ સાહાય્યં કર્તુમેવ|
9 વયં યદા દુર્બલા ભવામસ્તદા યુષ્માન્ સબલાન્ દૃષ્ટ્વાનન્દામો યુષ્માકં
સિદ્ધત્વં પ્રાર્થયામહે ચ| 10 અતો હેતોઃ પ્રભુ યુષ્માકં વિનાશાય નહિ કિન્તુ
નિષ્ઠાયૈ યત્ સામર્થ્યમ્ અસ્મભ્યં દત્તવાન્ તેન યદ્ ઉપસ્થિતિકાલે કાઠિન્યં
મયાચરિતવ્યં ન ભવેત્ તદર્થમ્ અનુપસ્થિતેન મયા સર્વાણ્યેતાનિ લિપ્યન્તે|
11 હે ભ્રાતરઃ, શેષે વદામિ યૂયમ્ આનન્દત સિદ્ધા ભવત પરસ્પરં પ્રબોધયત,
એકમનસો ભવત પ્રણયભાવમ્ આચરત| પ્રેમશાન્ત્યોરાકર ઇશ્વરો યુષ્માકં
સહાયો ભૂયાત્| 12 યૂયં પવિત્રયુષ્મનેન પરસ્પરં નમસ્કુરુધ્વં| 13
પવિત્રલોકાઃ સર્વે યુષ્માન્ નમન્તિ| 14 પ્રભો ર્થીશુખ્રીષ્ટસ્યાનુગ્રહ ઇશ્વરસ્ય
પ્રેમ પવિત્રસ્યાત્મનો ભાગિત્વઞ્ચ સર્વાન્ યુષ્માન્ પ્રતિ ભૂયાત્| તથાસ્તુ|

વર્ષત્રયે વ્યતીતેડહં પિતરં સમ્ભાષિતું ચિરૂશાલમં ગત્વા પઞ્ચદશદિનાનિ
 તેન સાદ્ધમ્ અતિષ્ઠં | 19 કિન્તુ તં પ્રભો ભ્રાતરં ચાકૂબઞ્ચ વિના પ્રેરિતાનાં
 નાન્યં કમપ્યપશ્યં | 20 ચાન્યેતાનિ વાક્યાનિ મયા લિપ્યન્તે તાન્યનૃતાનિ
 ન સન્તિ તદ્ ઈશ્વરો જાનાતિ | 21 તતઃ પરમ્ અહં સુરિયાં કિલિકિયાઞ્ચ
 દેશૌ ગતવાન્ | 22 તદાનીં ચિહ્નદાદેશસ્થાનાં પ્રીષ્ટસ્ય સમિતીનાં લોકાઃ
 સાક્ષાત્ મમ પરિચયમપ્રાપ્ય કેવલં જનશ્રુતિમિમાં લબ્ધવન્તઃ, 23 યો જનઃ
 પૂર્વમ્ અસ્માન્ પ્રત્યુપદ્રવમકરોત્ સ તદા યં ધર્મમનાશયત્ તમેવેદાનીં
 પ્રચારયતીતિ | 24 તસ્માત્ તે મામધીશ્વરં ધન્યમવદન્ |

2 અનન્તરં ચતુર્દશસુ વત્સરેષુ ગતેષ્વહં બાર્ણબ્બા સહ ચિરૂશાલમનગરં
 પુનરગચ્છં, તદાનોં તીતમપિ સ્વસક્તિમ્ અકરવં | 2 તત્કાલેડહમ્
 ઈશ્વરદર્શનાદ્ યાત્રામ્ અકરવં મયા યઃ પરિશ્રમોડકારિ કારિષ્યતે વા
 સ ચન્નિષ્કલો ન ભવેત્ તદર્થં ભિન્નજાતીયાનાં મધ્યે મયા ઘોષ્યમાણઃ
 સુસંવાદસ્તત્રત્યેભ્યો લોકેભ્યો વિશેષતો માન્યેભ્યો નરેભ્યો મયા ન્યવેદત |
 3 તતો મમ સહચરસ્તીતો યદપિ યૂનાનીય આસીત્ તથાપિ તસ્ય
 ત્વક્ષેદોડપ્યાવશ્યકો ન ભભૂવ | 4 યતશ્છલેનાગતા અસ્માન્ દાસાન્ કર્તુમ્
 ઈચ્છવઃ કતિપયા ભાક્તભ્રાતરઃ પ્રીષ્ટેન યીશુનાસ્મભ્યં દત્તં સ્વાતન્ત્ર્યમ્
 અનુસન્ધાતું યારા ઇવ સમાજં પ્રાવિશન્ | 5 અતઃ પ્રકૃતે સુસંવાદે યુષ્માકમ્
 અધિકારો યત્ તિષ્ઠેત્ તદર્થં વયં દાડૈકમપિ યાવદ્ આજ્ઞાગ્રહણેન તેષાં
 વશ્યા નાભવામ | 6 પરન્તુ યે લોકા માન્યાસ્તે યે કેચિદ્ ભવેયુસ્તાનહં
 ન ગણ્યામિ યત ઈશ્વરઃ કસ્યાપિ માનવસ્ય પક્ષપાતં ન કરોતિ, યે ય
 માન્યાસ્તે માં કિમપિ નવીનં નાજ્ઞાપયન્ | 7 કિન્તુ છિન્નત્વયાં મધ્યે
 સુસંવાદપ્રચારણસ્ય ભારઃ પિતરિ યથા સમર્પિતસ્તથૈવાચ્છિન્નત્વયાં મધ્યે
 સુસંવાદપ્રચારણસ્ય ભારો મયિ સમર્પિત ઇતિ તૈ ભુબુધે | 8 યતશ્છિન્નત્વયાં
 મધ્યે પ્રેરિતત્વકર્મણો યસ્ય યા શક્તિઃ પિતરમાશ્રિતવતી તસ્યૈવ સા શક્તિ
 ભિન્નજાતીયાનાં મધ્યે તસ્મૈ કર્મણો મામપ્યાશ્રિતવતી | 9 અતો મહાં
 દત્તમ્ અનુગ્રહં પ્રતિજ્ઞાય સ્તમ્ભા ઇવ ગણિતા યે ચાકૂબ્ કૈફા યોહન્ ચૈતે
 સહાયતાસૂચકં દક્ષિણહસ્તગ્રહંણ વિધાય માં બાર્ણબ્બાઞ્ચ જગદ્ઃ, યુવાં
 ભિન્નજાતીયાનાં સન્નિધિં ગચ્છતં વયં છિન્નત્વયા સન્નિધિં ગચ્છામઃ, 10
 કેવલં દરિદ્રા યુવાભ્યાં સ્મરણીયા ઇતિ | અતસ્તદેવ કર્તુમ્ અહં યતે સ્મ |

11 अपरम् आन्तियभियानगरं पितर आगतेऽहं तस्य द्रोषित्वात् समक्षं
तम् अभर्त्सयं | 12 यतः स पूर्वम् अन्यजातीयैः सार्द्धम् आहारमकरोत्
ततः परं यादृभः समीपात् कतिपयजनेष्वागतेषु स छिन्नत्वङ्गनुष्येभ्यो
भयेन निवृत्य पृथग् अभवत् | 13 ततोऽपरे सर्व्वे यिद्धूदिनोऽपि तेन सार्द्धं
कपटायारम् अकुर्व्वन् बार्णव्या अपि तेषां कापट्येन विपथगाभ्यभवत् |
14 ततस्ते प्रकृतसुसंवाद्दृषे सरलपथे न यरन्तीति दृष्ट्वाहं सर्व्वेषां साक्षात्
पितरम् उक्तवान् त्वं यिद्धूदी सन् यदि यिद्धूदिमतं विडाय भिन्नजातीय
एवायरसि तर्हि यिद्धूदिमतायरणाय भिन्नजातीयान् कुतः प्रवर्त्तयसि?
15 आवां जन्मना यिद्धूदिनौ भवावो भिन्नजातीयौ पापिनौ न भवावः
16 किन्तु व्यवस्थापालनेन मनुष्यः सपुत्रो न भवति केवलं यीशौ श्रीष्टे
यो विश्वासस्तेनैव सपुत्रो भवतीति बुद्ध्वावामपि व्यवस्थापालनं
विना केवलं श्रीष्टे विश्वासेन पुत्रप्राप्तये श्रीष्टे यीशौ विश्वसिव यतो
व्यवस्थापालनेन कोऽपि मानवः पुत्रं प्राप्तुं न शक्नोति | 17 परन्तु
यीशुना पुत्रप्राप्तये यतमानावप्यावां यदि पापिनौ भवावस्तर्हि किं
वक्तव्यं? श्रीष्टः पापस्य परिचारक इति? तन्न भवतु | 18 मया यद्
भग्नं तद् यदि मया पुनर्निर्मायते तर्हि मयैवात्मदोषः प्रकाश्यते | 19 अहं
यद् ईश्वराय ज्ञवामि तदर्थं व्यवस्थया व्यवस्थायै अग्निये | 20 श्रीष्टेन
सार्द्धं कुशे इतोऽस्मि तथापि ज्ञवामि किन्त्वहं ज्ञवामीति नहि श्रीष्टे अत्र
मदन्तं ज्ञवति | साम्प्रतं सशरीरेण मया यज्जवितं धार्त्त्यते तत् मम
दयाकारिणि मदर्थं स्वीयप्राणत्यागिनि येश्वरपुत्रे विश्वसता मया धार्त्त्यते |
21 अहमीश्वरस्यानुग्रहं नावजानामि यस्माद् व्यवस्थया यदि पुत्रं भवति
तर्हि श्रीष्टो निरर्थकमग्नियत |

3 हे निर्व्वोधा गालातिलोकाः, युष्माकं मध्ये कुशे इत एव यीशुः श्रीष्टो
युष्माकं समक्षं प्रकाशित आसीत् अतो यूयं यथा सत्यं वाक्यं न गृह्णीथ
तथा केनामुद्यत? 2 अहं युष्मत्तः कथामेकां जिज्ञासे यूयम् आत्मानं
केनालभध्वं? व्यवस्थापालनेन किं वा विश्वासवाक्यस्य श्रवणेन? 3
यूयं किम् ईदृग् अबोधो यद् आत्मना कर्म्मरिभ्य शरीरेण तत् साधयितुं
यतध्वे? 4 तर्हि युष्माकं गुरुतरो दुःखभोगः किं निष्कूलो भविष्यति?
कुङ्कुलयुक्तो वा किं भविष्यति? 5 यो युष्मत्तम् आत्मानं दत्तवान्

યુષ્મન્મધ્ય આશ્રય્યાંણિ કર્મ્યાંણિ ચ સાધિતવાન્ સ કિં વ્યવસ્થાપાલનેન
 વિશ્વાસવાક્યસ્ય શ્રવણેન વા તત્ કૃતવાન્? 6 લિખિતમાસ્તે, ઇબ્રાહીમ
 ઇશ્વરે વ્યશ્વસીત્ સ ચ વિશ્વાસસ્તસ્મૈ પુણ્યાર્થ ગણિતો બભૂવ, 7 અતો યે
 વિશ્વાસાશ્રિતાસ્ત એવેબ્રાહીમઃ સન્તાના ઇતિ યુષ્માભિ જ્ઞાયતાં | 8 ઇશ્વરો
 ભિન્નજાતીયાન્ વિશ્વાસેન સપુણ્યીકરિષ્યતીતિ પૂર્વ્વ જ્ઞાત્વા શાસ્ત્રદાતા
 પૂર્વ્વમ્ ઇબ્રાહીમં સુસંવાદં શ્રાવયન જગાદ, ત્વત્તો ભિન્નજાતીયાઃ સર્વ
 આશિષં પ્રાપ્સ્યન્તીતિ | 9 અતો યે વિશ્વાસાશ્રિતાસ્તે વિશ્વાસિનેબ્રાહીમા
 સાદ્ધમ્ આશિષં લભન્તે | 10 યાવન્તો લોકા વ્યવસ્થાયાઃ કર્મણ્યાશ્રયન્તિ
 તે સર્વે શાપાધીના ભવન્તિ યતો લિખિતમાસ્તે, યથા, "યઃ કશ્ચિદ્ એતસ્ય
 વ્યવસ્થાગ્રન્થસ્ય સર્વવાક્યાનિ નિશ્ચિદ્રં ન પાલયતિ સ શપ્ત ઇતિ | " 11
 ઇશ્વરસ્ય સાક્ષાત્ કોડપિ વ્યવસ્થયા સપુણ્યો ન ભવતિ તદ વ્યક્તં યતઃ
 "પુણ્યવાન્ માનવો વિશ્વાસેન જીવિષ્યતીતિ" શાસ્ત્રીયં વચઃ | 12 વ્યવસ્થા
 તુ વિશ્વાસસમ્બન્ધિની ન ભવતિ કિન્ત્વેતાનિ યઃ પાલયિષ્યતિ સ એવ તૈ
 જીવિષ્યતીતિનિયમસમ્બન્ધિની | 13 ખ્રીષ્ટોડસ્માન્ પરિક્રીય વ્યવસ્થાયાઃ
 શાપાત્ મોચિતવાન્ યતોડસ્માકં વિનિમયેન સ સ્વયં શાપાસ્પદમભવત્
 તદધિ લિખિતમાસ્તે, યથા, "યઃ કશ્ચિત્ તરાવુલ્લભ્યતે સોડભિશપ્ત
 ઇતિ | " 14 તસ્માદ્ ખ્રીષ્ટેન યીશુનેબ્રાહીમ આશી ભિન્નજાતીયલોકેષુ
 વર્તતે તેન વચં પ્રતિજ્ઞાતમ્ આત્માનં વિશ્વાસેન લબ્ધું શકનુમઃ | 15
 હે ભ્રાતૃગણ માનુષાણાં શીત્યનુસારેણાહં કથયામિ કેનચિત્ માનવેન
 યો નિયમો નિરચાયિ તસ્ય વિકૃતિ વૃદ્ધિ વા કેનાપિ ન ક્રિયતે | 16
 પરન્વિબ્રાહીમે તસ્ય સન્તાનાય ચ પ્રતિજ્ઞાઃ પ્રતિ શુશ્રુવિરે તત્ર સન્તાનશબ્દં
 બહુવચનાન્તમ્ અભૂત્વા તવ સન્તાનાયેત્યેકવચનાન્તં બભૂવ સ ચ
 સન્તાનઃ ખ્રીષ્ટ એવ | 17 અતએવાહં વદામિ, ઇશ્વરેણ યો નિયમઃ પુરા
 ખ્રીષ્ટમધિ નિરચાયિ તતઃ પરં ત્રિંશદધિકચતુઃશતવત્સરેષુ ગતેષુ સ્થાપિતા
 વ્યવસ્થા તં નિયમં નિરર્થકીકૃત્ય તદીયપ્રતિજ્ઞા લોપ્તું ન શકનોતિ | 18
 યસ્માત્ સમ્પદધિકારો યદિ વ્યવસ્થયા ભવતિ તર્હિ પ્રતિજ્ઞયા ન ભવતિ
 કિન્ત્વીશ્વરઃ પ્રતિજ્ઞયા તદધિકારિત્વમ્ ઇબ્રાહીમે ડદદાત્ | 19 તર્હિ
 વ્યવસ્થા કિમ્ભૂતા? પ્રતિજ્ઞા યસ્મૈ પ્રતિશ્રુતા તસ્ય સન્તાનસ્યાગમનં યાવદ્
 વ્યભિચારનિવારણાર્થ વ્યવસ્થાપિ દત્તા, સા ચ દૂતૈરાજ્ઞાપિતા મધ્યસ્થસ્ય

કરે સમર્પિતા ચ | 20 નૈકસ્ય મધ્યસ્થો વિધતે કિન્ત્વીશ્વર એક એવ |
 21 તર્હિ વ્યવસ્થા કિમ્ ઈશ્વરસ્ય પ્રતિજ્ઞાનાં વિરુદ્ધા? તન્ન ભવતુ |
 યસ્માદ્ યદિ સા વ્યવસ્થા જીવનદાનેસમર્થાભવિષ્યત્ તર્હિ વ્યવસ્થયૈવ
 પુણ્યલાભોડભવિષ્યત્ | 22 કિન્તુ યીશુખ્રીષ્ટે યો વિશ્વાસસ્તત્સમ્બન્ધિયાઃ
 પ્રતિજ્ઞાયાઃ ફલં યદ્ વિશ્વાસિલોકેભ્યો દીયતે તદર્થં શાસ્ત્રદાતા સર્વાન્
 પાપાધીનાન્ ગણયતિ | 23 અતએવ વિશ્વાસસ્યાનાગતસમયે વયં
 વ્યવસ્થાધીનાઃ સન્તો વિશ્વાસસ્યોદયં યાવદ્ રુદ્ધા ઇવારક્ષ્યામહે | 24
 ઇત્યં વયં યદ્ વિશ્વાસેન સપુણ્યીભવામસ્તદર્થં ખ્રીષ્ટસ્ય સમીપમ્ અસ્માન્
 નેતું વ્યવસ્થાગ્રથોડસ્માકં વિનેતા બભૂવ | 25 કિન્ત્વધુનાગતે વિશ્વાસે
 વયં તસ્ય વિનેતુરનધીના અભવામ | 26 ખ્રીષ્ટે યીશૌ વિશ્વસનાત્ સર્વો
 યૂયમ્ ઈશ્વરસ્ય સન્તાના જાતાઃ | 27 યૂયં યાવન્તો લોકાઃ ખ્રીષ્ટે મજ્જિજતા
 અભવત સર્વો ખ્રીષ્ટં પરિહિતવન્તઃ | 28 અતો યુષ્મન્મધ્યે ચિહ્નુદિયૂનાનિનો
 દાસસ્વતન્ત્રયો યોષાપુરુષયોશ્ચ કોડપિ વિશેષો નાસ્તિ; સર્વો યૂયં ખ્રીષ્ટે
 યીશાવેક એવ | 29 કિન્તુ યૂયં યદિ ખ્રીષ્ટસ્ય ભવથ તર્હિ સુતરામ્ ઇબ્રાહીમઃ
 સન્તાનાઃ પ્રતિજ્ઞાયા સમ્પદધિકારિણશ્રાધ્વે |

4 અહં વદામિ સમ્પદધિકારી યાવદ્ બાલસ્તિષ્ઠતિ તાવત્ સર્વસ્વસ્યાધિપતિઃ
 સન્નપિ સ દાસાત્ કેનાપિ વિષયેણ ન વિશિષ્યતે 2 કિન્તુ પિત્રા નિરૂપિતં
 સમયં યાવત્ પાલકાનાં ધનાધ્યક્ષાણાઞ્ચ નિધનસ્તિષ્ઠતિ | 3 તદ્દદ્ વયમપિ
 બાલ્યકાલે દાસા ઇવ સંસારસ્યાક્ષરમાલાયા અધીના આસ્મહે | 4
 અનન્તરં સમયે સમ્પૂર્ણતાં ગતવતિ વ્યવસ્થાધીનાનાં મોચનાર્થમ્ 5 અસ્માકં
 પુત્રત્વપ્રાપ્ત્યર્થએશ્વરઃ સ્ત્રિયા જાતં વ્યવસ્થાયા અધિનીભૂતઞ્ચ સ્વપુત્રં
 પ્રેષિતવાન્ | 6 યૂયં સન્તાના અભવત તત્કારણાદ્ ઈશ્વરઃ સ્વપુત્રસ્યાત્માનાં
 યુષ્માકમ્ અન્તઃકરણાનિ પ્રહિતવાન્ સ યાત્મા પિતઃ પિતરિત્યાહ્વાનં
 કારયતિ | 7 અત ઇદાનીં યૂયં ન દાસાઃ કિન્તુઃ સન્તાના એવ તસ્માત્
 સન્તાનત્વાચ્ય ખ્રીષ્ટેનેશ્વરીયસમ્પદધિકારિણોડપ્યાધ્વે | 8 અપરઞ્ચ પૂર્વ
 યૂયમ્ ઈશ્વરં ન જ્ઞાત્વા યે સ્વભાવતોડનીશ્વરાસ્તેષાં દાસત્વેડતિષ્ઠત | 9
 ઇદાનીમ્ ઈશ્વરં જ્ઞાત્વા યદિ વેશ્વરેણ જ્ઞાતા યૂયં કથં પુનસ્તાનિ વિફલાનિ
 તુચ્છાનિ ચાક્ષરાણિ પ્રતિ પરાવર્તિતું શક્નુથ? યૂયં કિં પુનસ્તેષાં દાસા
 ભવિતુમિચ્છથ? 10 યૂયં દિવસાન્ માસાન્ તિથીન્ સંવત્સરાંશ્ચ સમ્મન્યધ્વે |

11 યુષ્મદર્થ મયા યઃ પરિશ્રમોડકારિ સ વિફલો જાત ઇતિ યુષ્માનધ્યહં
બિભેમિ | 12 હે ભ્રાતરઃ, અહં યાદૃશોડસ્મિ યૂયમપિ તાદૃશા ભવતેતિ
પ્રાર્થયે યતોડહમપિ યુષ્મતુલ્યોડભવં યુષ્માભિ મમ કિમપિ નાપરાહ્નં | 13
પૂર્વમહં કલેવરસ્ય દૌર્બલ્યેન યુષ્માન્ સુસંવાદમ્ અજ્ઞાપયમિતિ યૂયં
જાનીથ | 14 તદાનીં મમ પરીક્ષકં શારીરકલેશં દૃષ્ટ્વા યૂયં મામ્ અવજ્ઞાય
ઋતીયિતવન્તસ્તન્નહિ કિન્ત્વીશ્વરસ્ય દૂતમિવ સાક્ષાત્ પ્રીષ્ટ યીશુમિવ
વા માં ગૃહીતવન્તઃ | 15 અતસ્તદાનીં યુષ્માકં યા ધન્યતાભવત્ સા ક્ક
ગતા? તદાનીં યૂયં યદિ સ્વેષાં નયનાન્યુત્પાટ્ય મહ્યં દાતુમ્ અશક્ચત તર્હિ
તદચ્ચકરિષ્યતેતિ પ્રમાણમ્ અહં દદામિ | 16 સામ્પ્રતમહં સત્યવાદિત્વાત્
કિં યુષ્માકં રિપુ જર્જતોડસ્મિ? 17 તે યુષ્મત્કૃતે સ્પર્દ્ધન્તે કિન્તુ સા સ્પર્દ્ધા
કુત્સિતા યતો યૂયં તાનધિ યત્ સ્પર્દ્ધ્યં તદર્થં તે યુષ્માન્ પૃથક્ કર્તુમ્
ઇચ્છન્તિ | 18 કેવલં યુષ્મત્સમીપે મમોપસ્થિતિસમયે તન્નહિ, કિન્તુ સર્વદૈવ
ભદ્રમધિ સ્પર્દ્ધનં ભદ્રં | 19 હે મમ બાલકાઃ, યુષ્મદન્ત યાવત્ પ્રીષ્ઠો મૂર્તિમાન્
ન ભવતિ તાવદ્ યુષ્મત્કારણાત્ પુનઃ પ્રસવવેદનેવ મમ વેદના જાયતે |
20 અહમિદાનીં યુષ્માકં સન્નિધિં ગત્વા સ્વરાન્તરેણ યુષ્માન્ સમ્ભાષિતું
કામયે યતો યુષ્માનધિ વ્યાકુલોડસ્મિ | 21 હે વ્યવસ્થાધીનતાકાક્ષિણઃ
યૂયં કિં વ્યવસ્થાયા વચનં ન ગૃહ્ણીથ? 22 તન્માં વદત | લિખિતમાસ્તે,
ઇબ્રાહીમો દ્વૌ પુત્રાવાસાતે તયોરેકો દાસ્યાં દ્વિતીયશ્ચ પત્ન્યાં જાતઃ | 23
તયો યો દાસ્યાં જાતઃ સ શારીરિકનિયમેન જજ્ઞે યશ્ચ પત્ન્યાં જાતઃ સ
પ્રતિજ્ઞયા જજ્ઞે | 24 ઇદમાખ્યાનં દૃષ્ટન્તસ્વરૂપં | તે દ્વે યોષિતાવીશ્વરીયસન્ધી
તયોરેકા સીનયપર્વતાદ્ ઉત્પન્ના દાસજનયિત્રી ય સા તુ હાજિરા | 25
યસ્માદ્ હાજિરાશબ્દેનારવદેશસ્થસીનયપર્વતો બોધ્યતે, સા ય વર્તમાનાયા
ચિરૂશાલમ્બુર્યાઃ સદૃશી | યતઃ સ્વબાલૈઃ સહિતા સા દાસત્વ આસ્તે | 26
કિન્તુ સ્વર્ગીયા ચિરૂશાલમ્પુરી પત્ની સર્વેષામ્ અસ્માકં માતા યાસ્તે | 27
યાદૃશં લિખિતમ્ આસ્તે, "વન્ધ્યે સન્તાનહીને ત્વં સ્વરં જયજયં કુરુ |
અપ્રસૂતે ત્વયોલ્લાસો જયાશબ્દશ્ચ ગીયતાં | યત એવ સનાથાયા યોષિતઃ
સન્તતે ગ્ણાત્ | અનાથા યા ભવેન્નારી તદપત્યાનિ ભૂરિશઃ | | " 28
હે ભ્રાતૃગણ, ઇમ્હાક્ ઇવ વયં પ્રતિજ્ઞયા જાતાઃ સન્તાનાઃ | 29 કિન્તુ
તદાનીં શારીરિકનિયમેન જાતઃ પુત્રો યદ્દદ્ આત્મિકનિયમેન જાતં પુત્રમ્

ઉપાદ્રવત્ તથાધુનાપિ | 30 કિન્તુ શાસ્ત્રે કિં લિખિતં? "ત્વમ્ ઇમાં દાસીં
તસ્યા: પુત્રાપસારય યત ઓષ દાસીપુત્ર: પત્નીપુત્રેણ સમં નોત્તરાધિકારી
ભવિવ્યતીતિ | " 31 અતએવ હે ભ્રાતર:, વયં દાસ્યા: સન્તાના ન ભૂત્વા
પાત્યા: સન્તાના ભવામ: |

5 પ્રીષ્ટોડસ્મભ્યં યત્ સ્વાતન્ત્ર્યં દત્તવાન્ યૂયં તત્ર સ્થિરાસ્તિષ્ઠત દાસત્વયુગેન
પુનર્ન નિબધ્યધ્વં | 2 પશ્યતાહં પૌલો યુષ્માન્ વદામિ યદિ છિન્નત્વયો
ભવથ તર્હિ પ્રીષ્ટેન કિમપિ નોપકારિષ્યધ્વે | 3 અપરં ય: કશ્ચિત્ છિન્નત્વગ્
ભવતિ સ કૃત્સ્નવ્યવસ્થાયા: પાલનમ્ ઇશ્વરાય ધારયતીતિ પ્રમાણં દદામિ |
4 યુષ્માકં યાવન્તો લોકા વ્યવસ્થયા સપુણ્યીભવિતું ચેષ્ટન્તે તે સર્વ્યે
પ્રીષ્ટાદ્ ભ્રષ્ટા અનુગ્રહાત્ પતિતાશ્ચ | 5 યતો વયમ્ આત્મના વિશ્વાસાત્
પુણ્યલાભાશાસિદ્ધં પ્રતીક્ષામહે | 6 પ્રીષ્ટે યીશૌ ત્વક્ષેદાત્વક્ષેદયો: કિમપિ
ગુણં નાસ્તિ કિન્તુ પ્રેમ્ના સફ્લો વિશ્વાસ એવ ગુણયુક્ત: | 7 પૂર્વ્યં યૂયં
સુન્દરમ્ અધાવત કિન્તિવદાનીં કેન બાધાં પ્રાપ્ય સત્યતાં ન ગૃહ્ણીથ? 8 યુષ્માકં
સા મતિ યુષ્મદાહ્વાનકારિણ ઇશ્વરાન્ જાતા | 9 વિકાર: કૃત્સ્નશક્તૂનાં
સ્વલ્પકિણ્વેન જસયતે | 10 યુષ્માકં મતિ વિકારં ન ગમિષ્યતીત્યહં યુષ્માનધિ
પ્રભુનાશંસે; કિન્તુ યો યુષ્માન્ વિચારલયતિ સ ય: કશ્ચિદ્ ભવેત્ સમુચિતં
દાર્દ્રં પ્રાપ્સ્યતિ | 11 પરન્તુ હે ભ્રાતર:, યદહમ્ ઇદાનીમ્ અપિ ત્વક્ષેદં
પ્રચારયેયં તર્હિ કુત ઉપદ્રવં ભુજ્ઞિય? તત્કૃતે કુશં નિર્બાધમ્ અભવિષ્યત્ |
12 યે જના યુષ્માકં યાઞ્ચલ્યં જનયન્તિ તેષાં છેદનમેવ મયાભિલષ્યતે | 13
હે ભ્રાતર:, યૂયં સ્વાતન્ત્ર્યાર્થમ્ આહૂતા આધ્વે કિન્તુ તત્સ્વાતન્ત્ર્યદ્વારેણ
શારીરિકભાવો યુષ્માન્ ન પ્રવિશતુ | યૂયં પ્રેમ્ના પરસ્પરં પરિચર્ય્યાં કુરુધ્વં |
14 યસ્માત્ ત્વં સમીપવાસિનિ સ્વવત્ પ્રેમ કુર્ય્યાં ઇત્યેકાજ્ઞા કૃત્સ્નાયા
વ્યવસ્થાયા: સારસંગ્રહ: | 15 કિન્તુ યૂયં યદિ પરસ્પરં દંદશ્યધ્વે ડશાશ્યધ્વે ય
તર્હિ યુષ્માકમ્ એકોડન્યેન યન્ન ગ્રસ્યતે તત્ર યુષ્માભિ: સાવધાનૈ ભવિતવ્યં |
16 અહં બ્રવીમિ યૂયમ્ આત્મિકાચારં કુરુત શારીરિકાભિલાષં મા પૂરયત |
17 યત: શારીરિકાભિલાષ આત્મનો વિપરીત:, આત્મિકાભિલાષશ્ચ શરીરસ્ય
વિપરીત:, અનયોરુભયો: પરસ્પરં વિરોધો વિદ્યતે તેન યુષ્માભિ ર્યદ્
અભિલષ્યતે તન્ન કર્તવ્યં | 18 યૂયં યદાત્મના વિનીયધ્વે તર્હિ વ્યવસ્થાયા
અધીના ન ભવથ | 19 અપરં પરદારગમનં વેશ્યાગમનમ્ અશુચિતા

कामुकता प्रतिमापूजनम् 20 छन्दोजालं शत्रुत्वं विवाहोऽन्तर्ज्वलनं क्रोधः
 कलहोऽनैक्यं 21 पार्थक्यम् छर्ष्या वधो भक्तत्वं लम्पटत्वमित्यादीनि स्पष्टत्वेन
 शारीरिकभावस्य कर्माणि सन्ति। पूर्वं यद्वत् मया कथितं तद्वत् पुनरपि
 कथ्यते ये जना अतादृशानि कर्माण्यारन्ति तैरीश्वरस्य राज्येऽधिकारः
 कदाय न लभ्यते। 22 किञ्च प्रेमानन्दः शान्तिश्चिरसिद्धिषुता हितैषिता
 भद्रत्वं विश्वास्यता तितिक्षा 23 परिमितभोजित्वमित्यादीन्यात्मनः इलानि
 सन्ति तेषां विरुद्धा कापि व्यवस्था नहि। 24 ये तु श्रीष्टस्य लोकास्ते
 रिपुभिरभिलाषैश्च सहितं शारीरिकभावं कुशे निहतवन्तः। 25 यद्वि वयम्
 आत्मना ज्ञवामस्तर्ह्यात्मिकायारोऽस्माभिः कर्तव्यः, 26 दर्पः परस्परं
 निर्भर्त्सनं द्वेषश्चास्माभिर्न कर्तव्यानि।

6 हे भ्रातरः, युष्माकं कश्चिद् यदि कस्मिंश्चित् पापे पतति तर्ह्यात्मिकभावयुक्तै
 र्युष्माभिस्तिक्ष्णत्वाभावं विधाय स पुनरुत्थाप्यतां यूयमपि यथा
 तादृक्परीक्षायां न पतथ तथा सावधाना भवत। 2 युष्माकम् अकेके
 जनः परस्य भारं वहत्यनेन प्रकारेण श्रीष्टस्य विधिं पालयत। 3 यद्वि
 कश्चन क्षुद्रः सन् स्वं महान्तं मन्यते तर्हि तस्यात्मवञ्चना जायते। 4
 अत अकेकेने जनेन स्वकीयकर्माणः परीक्षा क्रियतां तेन परं नालोक्य
 केवलम् आत्मा लोकनात् तस्य श्लघा सम्भविष्यति। 5 यत अकेके
 जनः स्वकीयं भारं वहत्यति। 6 यो जनो धर्मोपदेशं लभते स उपदेशारं
 स्वीयसर्वसम्पत्तेर्भागिनं करोतु। 7 युष्माकं भ्रान्तिर्न भवतु, ईश्वरो
 नोपहसितव्यः, येन यद् बीजम् उप्यते तेन तज्जातं शस्यं कर्त्तव्यते।
 8 स्वशरीरार्थं येन बीजम् उप्यते तेन शरीराद् विनाशरूपं शस्यं
 लभ्यते किन्त्वात्मनः कृते येन बीजम् उप्यते तेनात्मतोऽनन्तज्जितरूपं
 शस्यं लभ्यते। (aiōnios g166) 9 सत्कर्मकारणोऽस्माभिरश्रान्तै
 र्भवितव्यं यतोऽकलान्तौस्तिष्ठद्विरस्माभिरुपयुक्तसमये तत् इलानि
 लभ्यन्ते। 10 अतो यावत् समयस्तिष्ठति तावत् सर्वान् प्रति विशेषतो
 विश्वासवेशमवासिनः प्रत्यस्माभिर्हितायारः कर्त्तव्यः। 11 हे भ्रातरः,
 अहं स्वहस्तेन युष्मान् प्रति कियद्ब्रूत् पत्रं लिखितवान् तद् युष्माभि
 र्दृशतां। 12 ये शारीरिकविषये सुदृश्या भवितुमिच्छन्ति ते यत् श्रीष्टस्य
 कुशस्य कारणाद्ब्रूवद्वस्य भागिनो न भवन्ति केवलं तदर्थं त्वच्छेदे युष्मान्

प्रवर्तयन्ति। 13 ते त्वच्छेदग्राहिणोऽपि व्यवस्थां न पालयन्ति किन्तु
युष्मच्छरीरात् शलाघालाभार्थं युष्माकं त्वच्छेदम् इच्छन्ति। 14 किन्तु
येनाहं संसाराय हतः संसारोऽपि मह्यं हतस्तदस्मत्प्रभो र्यीशुप्रीष्टस्य
कुशं विनान्यत्र कुत्रापि मम शलाघनं कदापि न भवतु। 15 प्रीष्टे यीशौ
त्वच्छेदात्वच्छेदयोः किमपि गुणं नास्ति किन्तु नवीना सृष्टिरेव गुणयुक्ता।
16 अपरं यावन्तो लोका अेतस्मिन् मार्गे यरन्ति तेषाम् ईश्वरीयस्य
कृत्स्नस्येसायेलश्च शान्ति र्दयालाभश्च भूयात्। 17 हतः परं कोऽपि मां न
क्लिश्नातु यस्माद् अहं स्वगात्रे प्रभो र्यीशुप्रीष्टस्य यिहानि धारये। 18 हे
भ्रातरः अस्माकं प्रभो र्यीशुप्रीष्टस्य प्रसादो युष्माकम् आत्मनि स्थेयात्।
तथास्तु।

ઇફિષિણ:

1 ઈશ્વરસ્યેચ્છયા યીશુપ્રીષ્ટસ્ય પ્રેરિતઃ પૌલ ઈફિષનગરસ્થાન્ પવિત્રાન્ પ્રીષ્ટયીશૌ વિશ્વાસિનો લોકાન્ પ્રતિ પત્રં લિખતિ | 2 અસ્માકં તાતસ્યેશ્વરસ્ય પ્રભો રીશુપ્રીષ્ટસ્ય ચાનુગ્રહઃ શાન્તિશ્ચ યુષ્માસુ વર્તતાં | 3 અસ્માકં પ્રભો રીશોઃ પ્રીષ્ટસ્ય તાત ઈશ્વરો ધન્યો ભવતુઃ યતઃ સ પ્રીષ્ટેનાસ્મભ્યં સર્વમ્ આધ્યાત્મિકં સ્વર્ગીયવરં દત્તવાન્ | 4 વયં યત્ તસ્ય સમક્ષં પ્રેમ્ના પવિત્રા નિષ્કલઙ્કાશ્ચ ભવામસ્તદર્થં સ જગતઃ સૃષ્ટે પૂર્વં તેનાસ્માન્ અભિરોચિતવાન્, નિજાભિલષિતાનુરોધાય 5 યીશુના પ્રીષ્ટેન સ્વસ્ય નિમિત્તં પુત્રત્વપદેડસ્માન્ સ્વકીયાનુગ્રહસ્ય મહત્ત્વસ્ય પ્રશંસાર્થં પૂર્વં નિયુક્તવાન્ | 6 તસ્માદ્ અનુગ્રહાત્ સ યેન પ્રિયતમેન પુત્રેણાસ્માન્ અનુગૃહીતવાન્, 7 વયં તસ્ય શોણિતેન મુક્તિમ્ અર્થતઃ પાપક્ષમાં લબ્ધવન્તઃ | 8 તસ્ય ચ ઈદૃશોડનુગ્રહનિધિસ્તસ્માત્ સોડસ્મભ્યં સર્વવિધં જ્ઞાનં બુદ્ધિઞ્ચ બાહુલ્યરૂપેણ વિતરિતવાન્ | 9 સ્વર્ગપૃથિવ્યો ર્થધદ્ વિધતે તત્સર્વં સ પ્રીષ્ટે સંગ્રહીષ્યતીતિ હિતૈષિણા 10 તેન કૃતો યો મનોરથઃ સમ્પૂર્ણતાં ગતવત્સુ સમયેષુ સાધયિતવ્યસ્તમધિ સ સ્વકીયાભિલાષસ્ય નિગૂઢં ભાવમ્ અસ્માન્ જ્ઞાપિતવાન્ | 11 પૂર્વં પ્રીષ્ટે વિશ્વાસિનો યે વયમ્ અસ્મત્તો યત્ તસ્ય મહિમ્નઃ પ્રશંસા જાયતે, 12 તદર્થં યઃ સ્વકીયેચ્છાયાઃ મન્ત્રણાતઃ સર્વાણિ સાધયતિ તસ્ય મનોરથાદ્ વયં પ્રીષ્ટેન પૂર્વં નિરૂપિતાઃ સન્તોડધિકારિણો જાતાઃ | 13 યૂયમપિ સત્યં વાક્યમ્ અર્થતો યુષ્મત્પરિત્રાણસ્ય સુસંવાદં નિશમ્ય તસ્મિન્નેવ પ્રીષ્ટે વિશ્વસિતવન્તઃ પ્રતિજ્ઞાતેન પવિત્રેણાત્મના મુદ્રયેવાહ્નિતાશ્ચ | 14 યતસ્તસ્ય મહિમ્નઃ પ્રકાશાય તેન કીતાનાં લોકાનાં મુક્તિ ર્યાવન્ન ભવિષ્યતિ તાવત્ સ આત્માસ્માકમ્ અધિકારિત્વસ્ય સત્યહારસ્ય પાણસ્વરૂપો ભવતિ | 15 પ્રભૌ યીશૌ યુષ્માકં વિશ્વાસઃ સર્વેષુ પવિત્રલોકેષુ પ્રેમ યાસ્ત ઇતિ વાર્તા શ્રુત્વાહમપિ 16 યુષ્માનધિ નિરન્તરમ્ ઈશ્વરં ધન્યં વદન્ પ્રાર્થનાસમયે ય યુષ્માન્ સ્મરન્ વરમિમં યાયામિ | 17 અસ્માકં પ્રભો રીશુપ્રીષ્ટસ્ય તાતો યઃ પ્રભાવાકર ઈશ્વરઃ સ સ્વકીયતત્ત્વજ્ઞાનાય યુષ્મભ્યં જ્ઞાનજનકમ્ પ્રકાશિતવાક્યબોધકઆત્માનં દેયાત્ | 18 યુષ્માકં જ્ઞાનચક્ષૂષિ ય દીપ્તિયુક્તાનિ કૃત્વા તસ્યાહ્વાનં કીદૃશ્યા પ્રત્યાશયા સમ્બલિતં

पवित्रलोकानां मध्ये तेन दत्तोऽधिकारः कीदृशः प्रभावनिधिर्विश्वासिषु
यास्मासु प्रकाशमानस्य 19 तदीयमहापराक्रमस्य महत्त्वं कीदृग् अनुपमं तत्
सर्व्यं युष्मान् ज्ञापयतु। 20 यतः स यस्याः शक्तेः प्रबलतां श्रीष्टे प्रकाशयन्
भृतगणमध्यात् तम् उत्थापितवान्, 21 अधिपतित्वपदं शासनपदं पराक्रमो
राजत्वञ्चेतिनामानि यावन्ति पदानीह लोके परलोके च विधन्ते तेषां
सर्व्येषाम् उर्ध्वे स्वर्गे निजदक्षिणापार्श्वे तम् उपवेशितवान्, (aiōn g165)
22 सर्व्याणि तस्य यरणयोरधो निहितवान् या समितिस्तस्य शरीरं सर्व्यत्र
सर्व्येषां पूरयितुः पूरकञ्च भवति तं तस्या भूर्द्धानं कृत्वा 23 सर्व्येषाम्
उपर्युपरि नियुक्तवांश्च सैव शक्तिरस्मास्वपि तेन प्रकाशयते।

2 पुरा यूयम् अपराधैः पापैश्च मृताः सन्तस्तान्यायन्त एतलोकस्य
संसारानुसारेणाकाशराज्यस्याधिपतिम् (aiōn g165) 2 अर्थतः साम्प्रतम्
आज्ञालङ्घिष्यंशेषु कर्मकारिणाम् आत्मानम् अन्वप्रजत। 3 तेषां
मध्ये सर्व्ये वयमपि पूर्व्यं शरीरस्य मनस्कामनायाञ्छेदां साधयन्तः
स्वशरीरस्याभिलाषान् आचराम सर्व्येऽन्य एव य स्वभावतः
कोधभजनान्यभवाम। 4 किन्तु करुणानिधिरीश्वरो येन महाप्रेम्नास्मान्
दधितवान् 5 तस्य स्वप्रेम्नो बाहुल्याद् अपराधैर्भृतानप्यस्मान् श्रीष्टेन
सह जिवितवान् यतोऽनुग्रहाद् यूयं परित्राणं प्राप्ताः। 6 स य श्रीष्टेन
यीशुनास्मान् तेन सार्द्धम् उत्थापितवान् स्वर्गं उपवेशितवांश्च। 7 एत्थं स
श्रीष्टेन यीशुनास्मान् प्रति स्वहितैषितया भावियुगेषु स्वकीयानुग्रहस्यानुपमं
निधिं प्रकाशयितुम् एच्छति। (aiōn g165) 8 यूयम् अनुग्रहाद् विश्वासेन
परित्राणं प्राप्ताः, तस्य युष्मन्मूलकं नहि किन्त्वीश्वरस्यैव दानं, 9 तत्
कर्मणां फलम् अपि नहि, अतः केनापि न श्लाघितव्यं। 10 यतो वयं
तस्य कार्यं प्राग् एश्वरेण निरूपिताभिः सत्कियाभिः कालयापनाय श्रीष्टे
यीशौ तेन मृष्टाश्च। 11 पुरा जन्मना भिन्नजातीया हस्तकृतं त्वच्छेदं
प्राप्तैर्लोकैश्चाच्छिन्नत्वय एतिनाम्ना ज्ययाता ये यूयं तैर् युष्माभिरिदं
स्मर्त्तव्यं 12 यत् तस्मिन् समये यूयं श्रीष्टाद् भिन्ना एसायेल्लोकानां
सहवासार्द्दूरस्थाः प्रतिज्ञासम्बलितनियमानां बहिः स्थिताः सन्तो निराशा
निरीश्वराश्च जगत्याध्वम् एति। 13 किन्त्वधुना श्रीष्टे यीशावाश्रयं प्राप्य
पुरा दूरवर्त्तिनो यूयं श्रीष्टस्य शोणितेन निकटवर्त्तिनोऽभवत। 14 यतः

स अवास्माकं सन्धिः स द्वयम् अेकीकृतवान् शत्रुताऽपिर्णी मध्यवर्तिनीं
 प्रभेदकभित्तिं भग्नवान् दण्डाज्ञायुक्तं विधिशास्त्रं स्वशरीरेण लुप्तवांश्च |
 15 यतः स सन्धिं विधाय तौ द्वौ स्वस्मिन् अेकं नुतनं मानवं कर्तुं 16
 स्वकीयकुशे शत्रुतां निहत्य तेनैवैकस्मिन् शरीरे तयो द्वयोरीश्वरेण सन्धिं
 कारयितुं निश्चतवान् | 17 स यागत्य दूरवर्तिनो युष्मान् निकटवर्तिनो
 ऽस्मांश्च सन्धे भङ्गलवार्तां ज्ञापितवान् | 18 यतस्तस्माद् उभयपक्षीया
 वयम् अेकेनात्मना पितुः समीपं गमनाय सामर्थ्यं प्राप्तवन्तः | 19 अत
 एदानीं यूयम् असम्पर्कीया विदेशिनश्च न तिष्ठन्तः पवित्रलोकेः सडवासिन
 एश्वरस्य वेश्मवासिनश्चाध्वे | 20 अपरं प्रेरिता भविष्यद्वादिनश्च यत्र
 भित्तिमूलस्वऽपास्तत्र यूयं तस्मिन् मूले नियीयध्वे तत्र य स्वयं यीशुः श्रीष्टः
 प्रधानः कोणस्थप्रस्तरः | 21 तेन कृत्स्ना निर्मितः संग्रथ्यमाना प्रभोः
 पवित्रं मन्दिरं भवितुं वद्धते | 22 यूयमपि तत्र संग्रथ्यमाना आत्मनेश्वरस्य
 वासस्थानं भवथ |

3 अतो हेतो भिन्नजातीयानां युष्माकं निमित्तं यीशुः श्रीष्टस्य बन्दी यः
 सोऽहं पौलो ब्रवीमि | 2 युष्मदर्थम् एश्वरेण मह्यं दत्तस्य वरस्य नियमः
 कीदृशस्तद् युष्माभिरश्रावीति मन्ये | 3 अर्थतः पूर्वं मया संक्षेपेण यथा
 लिखितं तथाहं प्रकाशितवाक्येनेश्वरस्य निगूढं भावं ज्ञापितोऽभवम् |
 4 अतो युष्माभिस्तत् पठित्वा श्रीष्टमधि तस्मिन्निगूढे भावे मम ज्ञानं
 कीदृशं तद् भोत्स्यते | 5 पूर्वयुगेषु मानवसन्तानास्तं ज्ञापिता नासन्
 किन्त्वधुना स भावस्तस्य पवित्रान् प्रेरितान् भविष्यद्वादिनश्च प्रत्यात्मना
 प्रकाशितोऽभवत्; 6 अर्थत एश्वरस्य शक्तेः प्रकाशात् तस्यानुग्रहेण
 यो वरो मह्यम् अदायि तेनाहं यस्य सुसंवाद्स्य परियारकोऽभवम्, 7
 तद्वारा श्रीष्टेन भिन्नजातीया अन्यैः सार्द्धम् अेकाधिकारा अेकशरीरा
 अेकस्याः प्रतिज्ञाया अंशिनश्च भविष्यन्तीति | 8 सर्वेषां पवित्रलोकानां
 क्षुद्रतमाय मह्यं वरोऽयम् अदायि यद् भिन्नजातीयानां मध्ये बोधागयस्य
 गुणनिधेः श्रीष्टस्य भङ्गलवार्तां प्रचारयामि, 9 कालावस्थातः पूर्वस्माद्य
 यो निगूढभाव एश्वरे गुप्त आसीत् तदीयनियमं सर्वान् ज्ञापयामि |
 (aiōn g165) 10 यत एश्वरस्य नानाऽपं ज्ञानं यत् साम्प्रतं समित्या स्वर्गे
 प्राधान्यपराक्रमयुक्तानां दूतानां निकटे प्रकाश्यते तदर्थं स यीशुना श्रीष्टेन

सर्वीणि सृष्टवान् | 11 यतो वयं यस्मिन् विश्वस्य दृढमकृत्या निर्भयताम्
 ईश्वरस्य समागमे सामर्थ्यञ्च 12 प्राप्तवन्तस्तमस्माकं प्रभुं यीशुं श्रीष्टमधि
 स कालावस्थायाः पूर्वं तं मनोरथं कृतवान् | (aiōn g165) 13 अतोऽहं
 युष्मन्निमित्तं दुःखभोगेन क्लान्तिं यन्न गच्छामीति प्रार्थये यतस्तदेव
 युष्माकं गौरवं | 14 अतो हेतोः स्वर्गपृथिव्योः स्थितः कृत्स्नो वंशो यस्य
 नाम्ना विख्यातस्तम् 15 अस्मत्प्रभो यीशुश्रीष्टस्य पितरमुद्दिश्याहं जनुनी
 पातयित्वा तस्य प्रभावनिधितो वरमिमं प्रार्थये | 16 तस्यात्मना युष्माकम्
 आन्तरिकपुरुषस्य शक्ते वृद्धिः क्रियतां | 17 श्रीष्टस्तु विश्वासेन युष्माकं
 हृदयेषु निवसतु | प्रेमणि युष्माकं बद्धमूलत्वं सुस्थिरत्वञ्च भवतु | 18 एतं
 प्रस्थताया दीर्घताया गभीरताया उच्यतायाश्च बोधाय सर्वैः पवित्रलोकैः
 प्रायं सामर्थ्यं युष्माभिर्लभ्यतां, 19 ज्ञानातिरिक्तं श्रीष्टस्य प्रेम ज्ञायताम्
 ईश्वरस्य सम्पूर्णवृद्धिपर्यन्तं युष्माकं वृद्धिर्भवतु य | 20 अस्माकम्
 अन्तरे या शक्तिः प्रकाशते तथा सर्वीतिरिक्तं कर्म कुर्वन् अस्माकं प्रार्थनां
 कल्पनाञ्जातिक्रमितुं यः शक्नोति 21 श्रीष्टयीशुना समिते मध्ये सर्वेषु युगेषु
 तस्य धन्यवाद्यो भवतु | एति | (aiōn g165)

4 अतो बन्दिहं प्रभो नाम्ना युष्मान् विनये यूयं
 येनाह्वानेनाहूतास्तद्गुणयुक्तज्ञेय 2 सर्वथा नम्रतां भूतां तितिक्षां परस्परं
 प्रभ्ना सङ्घिषुताञ्चायरत | 3 प्राणयबन्धनेन यात्मन अेक्यं रक्षितुं यतध्वं |
 4 यूयम् अेकशरीरा अेकात्मानश्च तद्द्व आह्वानेन यूयम् अेकप्रत्याशाप्राप्तये
 समाहूताः | 5 युष्माकम् अेकः प्रभुरेको विश्वास अेकं मज्जन्, सर्वेषां
 तातः 6 सर्वोपरिस्थः सर्वव्यापी सर्वेषां युष्माकं मध्यवर्ती यैक ईश्वर
 आस्ते | 7 किन्तु श्रीष्टस्य दानपरिमाणानुसाराद् अस्माकम् अेकैकस्मै
 विशेषो वरोऽदायि | 8 यथा लिपितम् आस्ते, "उर्ध्वम् आरुह्य जेतुं स
 विजित्य बन्दिनोऽकरोत् | ततः स मनुजैर्भ्योऽपि स्वीयान् व्यश्राणयद्
 वरान् | " 9 उर्ध्वम् आरुह्येतिवाक्यस्यायमर्थः स पूर्वं पृथिवीज्ञं
 सर्वधःस्थितं स्थानम् अवतीर्णवान्; 10 यश्चावतीर्णवान् स अेव
 स्वर्गाणाम् उपर्युपर्याङ्गवान् यतः सर्वीणि तेन पूरयितव्यानि | 11 स
 अेव य कांश्चन प्रेरितान् अपरान् भविष्यद्वादिनोऽपरान् सुसंवाद्यप्रचारकान्
 अपरान् पालकान् उपदेशकांश्च नियुक्तवान् | 12 यावद् वयं सर्वे

વિશ્વાસસ્યેશ્વરપુત્રવિષયકસ્ય તત્ત્વજ્ઞાનસ્ય ચૈક્યં સમ્પૂર્ણં પુરુષર્થઞ્ચાર્થતઃ
 ખ્રીષ્ટસ્ય સમ્પૂર્ણપરિમાણસ્ય સમં પરિમાણં ન પ્રાપ્નુમસ્તાવત્ 13 સ
 પરિચર્યાકર્મસાધનાય ખ્રીષ્ટસ્ય શરીરસ્ય નિષ્ઠાયૈ ચ પવિત્રલોકાનાં
 સિદ્ધતાયાસ્તાદૃશમ્ ઉપાયં નિશ્ચિતવાન્ | 14 અતએવ માનુષાણાં ચાતુરીતો
 ભ્રમકધૂર્તતાયાશ્છલાચ્ય જાતેન સર્વેણ શિક્ષાવાયુના વયં યદ્ બાલકા ઇવ
 દોલાયમાના ન ભ્રામ્યામ ઇત્યસ્માભિ ર્યતિતવ્યં, 15 પ્રેમ્ના સત્યતામ્
 આચરદ્ધિઃ સર્વવિષયે ખ્રીષ્ટમ્ ઉદ્દિશ્ય વર્દ્ધિતવ્યઞ્ચ, યતઃ સ મૂર્ઘા, 16
 તસ્માચ્ચૈકૈકસ્યાઙ્ગસ્ય સ્વસ્વપરિમાણાનુસારેણ સાહાય્યકરણાદ્ ઉપકારકૈઃ
 સર્વેઃ સન્ધિભિઃ કૃત્સ્નસ્ય શરીરસ્ય સંયોગે સમ્મિલને ચ જાતે પ્રેમ્ના નિષ્ઠાં
 લભમાનં કૃત્સ્નં શરીરં વૃદ્ધિં પ્રાપ્નોતિ | 17 યુષ્માન્ અહં પ્રભુનેદં
 બ્રવીમ્યાદિશામિ ચ, અન્યે ભિન્નજાતીયા ઇવ યૂયં પૂન મચિરત | 18 યતસ્તે
 સ્વમનોમાયામ્ આચરન્ત્યાન્તરિકાજ્ઞાનાત્ માનસિકકાઠિન્યાચ્ય
 તિમિરાવૃત્બુદ્ધ્ય ઇશ્વરીયજીવનસ્ય બગીર્ભૂતાશ્ચ ભવન્તિ, 19 સ્વાન્
 ચૈતન્યશૂન્યાન્ કૃત્વા ચ લોભેન સર્વવિધાશૌચાચરણાય લમ્પટતાયાં સ્વાન્
 સમર્પિતવન્તઃ | 20 કિન્તુ યૂયં ખ્રીષ્ટં ન તાદૃશં પરિચિતવન્તઃ, 21 યતો યૂયં તં
 શ્રુતવન્તો યા સત્યા શિક્ષા યીશુતો લભ્યા તદનુસારાત્ તદીયોપદેશં
 પ્રાપ્તવન્તશ્ચેતિ મન્યે | 22 તસ્માત્ પૂર્વકાલિકાચારકારી યઃ પુરાતનપુરુષો
 માયાભિલાષૈર્નશ્યતિ તં ત્યક્ત્વા યુષ્માભિ મ્હાનસિકભાવો નૂતનીકર્તવ્યઃ,
 23 યો નવપુરુષ ઇશ્વરાનુરૂપેણ પુણ્યેન સત્યતાસહિતેન 24 ધાર્મિકત્વેન ચ
 સૃષ્ટઃ સ એવ પરિઘાતવ્યશ્ચ | 25 અતો યૂયં સર્વે મિથ્યાકથનં પરિત્યજ્ય
 સમીપવાસિભિઃ સહ સત્યાલાપં કુરુત યતો વયં પરસ્પરમ્ અઙ્ગપ્રત્યઙ્ગા
 ભવામઃ | 26 અપરં ક્રોધે જાતે પાપં મા કુરુધ્વમ્, અશાન્તે યુષ્માકં
 રોષેસૂચ્યોડસ્તં ન ગચ્છતુ | 27 અપરં શયતાને સ્થાનં મા દત્ત | 28 ચોરઃ
 પુનશ્ચૈર્યં ન કરોતુ કિન્તુ દીનાય દાને સામર્થ્યં યજ્જાયતે તદર્થં સ્વકરાભ્યાં
 સદ્વૃત્યા પરિશ્રમં કરોતુ | 29 અપરં યુષ્માકં વદનેભ્યઃ કોડપિ
 કદાલાપો ન નિર્ગચ્છતુ, કિન્તુ યેન શ્રોતુરુપકારો જાયતે તાદૃશઃ
 પ્રયોજનીયનિષ્ઠાયૈ ફલદાયક આલાપો યુષ્માકં ભવતુ | 30 અપરઞ્ચ યૂયં
 મુક્તિદિનપર્યન્તમ્ ઇશ્વરસ્ય યેન પવિત્રેણાત્મના મુદ્રયાહ્નિતા અભવત તં
 શોકાન્વિતં મા કુરુત | 31 અપરં કટુવાક્યં રોષઃ ક્રોષઃ કલહો નિન્દા

સર્વવિધદ્વેષશ્ચૈતાનિ યુષ્માકં મધ્યાદ્ દૂરીભવન્તુ | 32 યૂયં પરસ્પરં
હિતૈષિણઃ કોમલાન્તઃકરણાશ્ચ ભવત | અપરમ્ ઈશ્વરઃ પ્રીષ્ટેન યદ્દદ્
યુષ્માકં દોષાન્ ક્ષમિતવાન્ તદ્દદ્ યૂયમપિ પરસ્પરં ક્ષમધ્વં |

5 અતો યૂયં પ્રિયબાલકા ઇવેશ્વરસ્થાનુકારિણો ભવત, 2 પ્રીષ્ટ ઇવ
પ્રેમાચારં કુરુત ય, યતઃ સોડસ્માસુ પ્રેમ કૃતવાન્ અસ્માકં વિનિમયેન
યાત્મનિવેદનં કૃત્વા ગ્રાહ્યસુગન્ધાર્થકમ્ ઉપહારં બલિઞ્ચેશ્વરાય દત્તવાન્ | 3
કિન્તુ વેશ્યાગમનં સર્વવિધાશૌચક્રિયા લોભશ્ચૈતેષામ્ ઉચ્ચારણમપિ યુષ્માકં
મધ્યે ન ભવતુ, એતદેવ પવિત્રલોકાનામ્ ઉચિતં | 4 અપરં કુત્સિતાલાપઃ
પ્રલાપઃ શ્લેષોક્તિશ્ચ ન ભવતુ યત એતાન્યનુચિતાનિ કિન્ત્વીશ્વરસ્ય
ધન્યવાદો ભવતુ | 5 વેશ્યાગામ્યશૌચાચારી દેવપૂજક ઇવ ગણ્યો લોભી
ચૈતેષાં કોષિ પ્રીષ્ટસ્ય રાજ્યેડર્થત ઈશ્વરસ્ય રાજ્યે કમપ્યધિકારં ન
પ્રાપ્સ્યતીતિ યુષ્માભિઃ સમ્યક્ જ્ઞાયતાં | 6 અનર્થકવાક્યેન કોડપિ યુષ્માન્ ન
વચ્ચયતુ યતસ્તાદ્ગાચારહેતોરનાજ્ઞાગ્રાહિષુ લોકેષ્વીશ્વરસ્ય કોપો વર્તતે |
7 તસ્માદ્ યૂયં તૈઃ સહભાગિનો ન ભવત | 8 પૂર્વ્ય યૂયમ્ અન્ધકારસ્વરૂપા
આધ્વં કિન્ત્વિદાનીં પ્રભુના દીપ્તિસ્વરૂપા ભવથ તસ્માદ્ દીપ્તેઃ સન્તાના ઇવ
સમાચરત | 9 દીપ્તે ર્યત્ ફલં તત્ સર્વવિધહિતૈષિતાયાં ધર્મ્મે સત્યાલાપે
ય પ્રકાશતે | 10 પ્રભવે યદ્ રોચતે તત્ પરીક્ષધ્વં | 11 યૂયં તિમિરસ્ય
વિક્લકર્માણામ્ અંશિનો ન ભૂત્વા તેષાં દોષિત્વં પ્રકાશયત | 12 યતસ્તે
લોકા રહમિ યદ્ યદ્ આચરન્તિ તદુચ્ચારણામ્ અપિ લજ્જાજનકં | 13
યતો દીપ્ત્યા યદ્ યત્ પ્રકાશ્યતે તત્ તયા ચકાસ્યતે યચ્ચ ચકાસ્તિ તદ્
દીપ્તિસ્વરૂપં ભવતિ | 14 એતત્કારણાદ્ ઉક્તમ્ આસ્તે, "હે નિદ્રિત
પ્રબુધ્યસ્વ મૃતેભ્યશ્ચોત્થિતિ કુરુ | તત્કૃતે સૂર્યવત્ પ્રીષ્ટઃ સ્વયં ત્વાં
ધોતયિષ્યતિ | " 15 અતઃ સાવધાના ભવત, અજ્ઞાના ઇવ માચરત કિન્તુ
જ્ઞાનિન ઇવ સતર્કમ્ આચરત | 16 સમયં બહુમૂલ્યં ગણાયધ્વં યતઃ
કાલા અભદ્રાઃ | 17 તસ્માદ્ યૂયમ્ અજ્ઞાના ન ભવત કિન્તુ પ્રભોરભિમતં
કિં તદવગતા ભવત | 18 સર્વવનાશજનકેન સુરાપાનેન મત્તા મા ભવત
કિન્ત્વાત્મના પૂર્યધ્વં | 19 અપરં ગીતૈર્ગાનેઃ પારમાર્થિકકીર્ત્તનૈશ્ચ પરસ્પરમ્
આલપન્તો મનસા સાદ્ધ્વં પ્રભુમ્ ઉદ્દિશ્ય ગાયત વાદયત ય | 20 સર્વદા
સર્વવિષયેડસ્મત્રભો યીશોઃ પ્રીષ્ટસ્ય નામ્ના તાતમ્ ઈશ્વરં ધન્યં વદત | 21

यूयम् ष्वराद् बीताः सन्त अन्येऽपरेषां वशीभूता भवत | 22 हे योषितः,
 यूयं यथा प्रभोस्तथा स्वस्वस्वामिनो वशङ्गता भवत | 23 यतः श्रीष्टो यद्दत्
 समिते भूर्द्धा शरीरस्य त्राता य भवति तद्दत् स्वामी योषितो भूर्द्धा | 24
 अतः समिति र्यद्दत् श्रीष्टस्य वशीभूता तद्दत् योषिद्विरपि स्वस्वस्वामिनो
 वशता स्वीकर्तव्या | 25 अपरत्र हे पुरुषाः, यूयं श्रीष्ट एव स्वस्वयोषित्सु
 प्रीयध्वं | 26 स श्रीष्टोऽपि समितौ प्रीतवान् तस्याः कृते य स्वप्राणान्
 त्यक्तवान् यतः स वाक्ये जलमज्जनेन तां परिष्कृत्य पावयितुम् 27 अपरं
 तिलकवल्यादिविहीनां पवित्रां निष्कलङ्गां तां समितिं तेजस्विनीं कृत्वा
 स्वहस्ते समर्पयितुं आभिलषितवान् | 28 तस्मात् स्वतनुवत् स्वयोषिति
 प्रेमकरणं पुरुषस्योचितं, येन स्वयोषिति प्रेम क्रियते तेनात्मप्रेम क्रियते |
 29 कोऽपि कदापि न स्वकीयां तनुम् ऋतीयितवान् किन्तु सर्व्वे तां विभ्रति
 पुष्पान्ति य | श्रीष्टोऽपि समितिं प्रति तदेव करोति, 30 यतो वयं तस्य
 शरीरस्याङ्गानि मांसास्थीनि य भवामः | 31 अेतदर्थं मानवः स्वमातापितरो
 परित्यज्य स्वभार्यायाम् आसंक्ष्यति तौ द्वौ जनावेकाङ्गौ भविष्यतः |
 32 अेतन्निगूढवाक्यं गुरुतरं मया य श्रीष्टसमिती अधि तद् उच्यते | 33
 अतओव युष्माकम् ओकैको जन आत्मवत् स्वयोषिति प्रीयतां भार्यापि
 स्वाभिनं समाहर्तुं यततां |

6 हे बालकाः, यूयं प्रभुम् उद्दिश्य पित्रोराज्ञाग्राहिलो भवत यतस्तत्
 न्याय्यं | 2 त्वं निजपितरं मातरत्र सम्मन्यस्वेति यो विधिः स प्रतिज्ञायुक्तः
 प्रथमो विधिः 3 इलतस्तस्मात् तव कल्याणं देशे य दीर्घकालम् आयु
 र्भविष्यतीति | 4 अपरं हे पितरः, यूयं स्वबालकान् मा रोषयत किन्तु
 प्रभो विनीत्यादेशाभ्यां तान् विनयत | 5 हे दासाः, यूयं श्रीष्टम् उद्दिश्य
 सभयाः कम्पान्विताश्च भूत्वा सरलान्तःकरणैरैडिकप्रभूनाम् आज्ञाग्राहिलो
 भवत | 6 दृष्टिगोचरीयपरियर्य्या मानुषेभ्यो रोयितुं मा यतध्वं किन्तु
 श्रीष्टस्य दासा एव निविष्टमनोभिरीश्वरस्येच्छां साधयत | 7 मानवान्
 अनुद्दिश्य प्रभुमेवोद्दिश्य सद्भावेन दास्यकर्म कुरुध्वं | 8 दासमुक्तयो र्येन
 यत् सत्कर्म क्रियते तेन तस्य इलं प्रभुतो लप्स्यत इति जानीत य | 9 अपरं
 हे प्रभवः, युष्माभि र्भर्त्सनं विहाय तान् प्रति न्याय्यायराणं क्रियतां यश्च
 कस्यापि पक्षपातं न करोति युष्माकमपि तादृश अेकः प्रभुः स्वर्गो विधत इति

ज्ञायतां। 10 अधिकन्तु हे भ्रातरः, यूयं प्रभुना तस्य विक्रमयुक्तशक्त्या य
 भलवन्तो भवत। 11 यूयं यत् शयतानश्छलानि निवारयितुं शक्नुथ तदर्थम्
 ईश्वरीयसुसज्जं परिधेयम्। 12 यतः केवलं रक्तमांसाभ्याम् एति नहि
 किन्तु कर्तृत्वपराक्रमयुक्तैस्तिमिरराज्यस्येडलोडस्याधिपतिभिः स्वर्गोद्भवै
 दृष्टात्मभिरेव सार्द्धम् अस्माभि र्युद्धं क्रियते। (aiōn g165) 13 अतो हेतो
 र्युयं यथा संकुले दिनेऽवस्थातुं सर्वाणि पराजित्य दृढाः स्थातुञ्च शक्यथ
 ताम् ईश्वरीयसुसज्जं गृह्णीत। 14 वस्तुतस्तु सत्यत्वेन शृङ्गभलेन कटिं
 बद्ध्वा पुण्येन वर्मणा वक्ष आस्थाध 15 शान्तेः सुवार्त्तया जातम् उत्साहं
 पादुकायुगलं पदे समर्थं तिष्ठत। 16 येन य दृष्टात्मनोऽग्निबाणान् सर्वान्
 निर्व्यापयितुं शक्यथ तादृशं सर्वाय्यादकं इलकं विश्वासं धारयत। 17
 शिरस्त्रं परित्राणम् आत्मनः अङ्गेश्वरस्य वाक्यं धारयत। 18 सर्वसमये
 सर्वयायनेन सर्वप्रार्थनेन यात्मना प्रार्थनां कुरुध्वं तदर्थं दृढाकाङ्क्षया
 जात्रतः सर्वेषां पवित्रलोकानां कृते सदा प्रार्थनां कुरुध्वं। 19 अहञ्च
 यस्य सुसंवाद्यस्य शृङ्गभलबद्धः प्रयारकदूतोऽस्मि तम् उपयुक्तेनोत्साहेन
 प्रयारयितुं यथा शक्नुयां 20 तथा निर्भयेन स्वरेणोत्साहेन य सुसंवाद्यस्य
 निगूढवाक्यप्रयाराय वक्तृता यत् मह्यं दीयते तदर्थं ममापि कृते प्रार्थनां
 कुरुध्वं। 21 अपरं मम यावस्थास्ति यय्य मया क्रियते तत् सर्वं यद्
 युष्माभि ज्ञायते तदर्थं प्रभुना प्रियभ्राता विश्वास्यः परियारकश्च तुभिको
 युष्मान् तत् ज्ञापयिष्यति। 22 यूयं यद् अस्माकम् अवस्थां जानीथ
 युष्माकं मनांसि य यत् सान्त्वनां लभन्ते तदर्थमेवाहं युष्माकं सन्निधिं तं
 प्रेषितवान्। 23 अपरम् ईश्वरः प्रभु र्यीशुप्रीष्टश्च सर्वोत्थो भ्रातृभ्यः
 शान्तिं विश्वाससहितं प्रेम य देयात्। 24 ये केचित् प्रभौ यीशुप्रीष्टेऽक्षयं
 प्रेम कुर्वन्ति तान् प्रति प्रसादो भूयात्। तथास्तु।

इलिपिनः

1 पौलतीमथिनामानौ यीशुप्रीष्टस्य दासौ इलिपिनगरस्थान् प्रीष्टयीशोः
सर्वान् पवित्रलोकान् समितेरध्यक्षान् परियारकांश्च प्रति पत्रं लिखतः | 2
अस्माकं तात एश्वरः प्रभु र्यीशुप्रीष्टश्च युष्मत्स्य प्रसादस्य शान्तेश्च भोगं
देयास्तां | 3 अहं निरन्तरं निजसर्वप्रार्थनासु युष्माकं सर्वेषां कृते सानन्दं
प्रार्थनां कुर्वन् 4 यति वारान् युष्माकं स्मरामि तति वारान् आ प्रथमाद्
अध यावद् 5 युष्माकं सुसंवाद्यभागित्वकारणाद् एश्वरं धन्यं वदामि | 6
युष्मन्मध्ये येनोत्तमं कर्म कर्तुम् आरम्भे तेनैव यीशुप्रीष्टस्य दिनं यावत्
तत् साधयिष्यत इत्यस्मिन् दृढविश्वासो ममास्ते | 7 युष्मान् सर्वान्
अधि मम तादृशो भावो यथार्थो यतोऽहं कारावस्थायां प्रत्युत्तरकरणे
सुसंवाद्यस्य प्रामाण्यकरणे य युष्मान् सर्वान् मया सार्द्धम् अंकानुग्रहस्य
भागिनो भत्वा स्वहृदये धारयामि | 8 अपरम् अहं प्रीष्टयीशोः स्नेहवत्
स्नेहेन युष्मान् कीदृशं काङ्क्षामि तदधीश्वरो मम साक्षी विधत्ते | 9
मया यत् प्रार्थ्यते तद् एहं युष्माकं प्रेम नित्यं वृद्धिं गत्वा 10 ज्ञानस्य
विशिष्टानां परीक्षिकायाश्च सर्वविधबुद्धेर्बाहुल्यं इल्लुत् 11 प्रीष्टस्य
दिनं यावद् युष्माकं सारल्यं निर्विघ्नत्वञ्च भवतु, एश्वरस्य गौरवाय
प्रशंसायै य यीशुना प्रीष्टेन पुण्यइलानां पूर्णता युष्मत्स्य दीयताम् इति |
12 हे भ्रातरः, मां प्रति यद् यद् घटितं तेन सुसंवाद्यप्रचारस्य बाधा नहि
किन्तु वृद्धिरेव जाता तद् युष्मान् ज्ञापयितुं कामयेऽहं | 13 अपरम् अहं
प्रीष्टस्य कृते बद्धोऽस्मीति राजपुत्र्याम् अन्यस्थानेषु य सर्वेषां निकटे
सुस्यष्टम् अभवत्, 14 प्रभुसम्बन्धीया अनेके भ्रातरश्च मम बन्धनाद्
आश्वासं प्राप्य वर्द्धमानेनोत्साहेन निःक्षोभं कथां प्रचारयन्ति | 15
केचिद् द्वेषाद् विरोधाख्यापरे केचिच्च सद्भावात् प्रीष्टं घोषयन्ति; 16 ये
विरोधात् प्रीष्टं घोषयन्ति ते पवित्रभावात् तन्न कुर्वन्तो मम बन्धनानि
बहुतरकलोशदायीनि कर्तुम् इच्छन्ति | 17 ये य प्रेम्णा घोषयन्ति ते
सुसंवाद्यस्य प्रामाण्यकरणेऽहं नियुक्तोऽस्मीति ज्ञात्वा तत् कुर्वन्ति |
18 किं बहुना? कापट्यात् सरलभावाद् वा भवेत्, येन केनचित् प्रकारेण
प्रीष्टस्य घोषणा भवतीत्यस्मिन् अहम् आनन्दाभ्यान्दिष्यामि य |
19 युष्माकं प्रार्थनया यीशुप्रीष्टस्यात्मनश्चोपकारेण तत् मन्निस्तारजनकं

ભવિષ્યતીતિ જાનામિ | 20 તત્ર ચ મમાકાડ્ક્ષા પ્રત્યાશા ચ સિદ્ધિ
ગમિષ્યતિ ફલતોડહં કેનાપિ પ્રકારેણ ન લજિજષ્યે કિન્તુ ગતે સર્વસ્મિન્
કાલે યદ્વત્ તદ્દદ્ ઇદાનીમપિ સમ્પૂર્ણોત્સાહદ્વારા મમ શરીરેણ પ્રીષ્ટસ્ય
મહિમા જીવને મરણે વા પ્રકાશિષ્યતે | 21 યતો મમ જીવનં પ્રીષ્ટાય
મરણઞ્ચ લાભાય | 22 કિન્તુ યદિ શરીરે મયા જીવિતવ્યં તર્હિ તત્ કર્મફલં
ફલિષ્યતિ તસ્માત્ કિં વરિતવ્યં તન્મયા ન જ્ઞાયતે | 23 દ્વાભ્યામ્ અહં
સમ્પીડયે, દેહવાસત્યજનાય પ્રીષ્ટેન સહવાસાય ચ મમાભિલાષો ભવતિ
યતસ્તત્ સર્વોત્તમં | 24 કિન્તુ દેહે મમાવસ્થિત્યા યુષ્માકમ્ અધિકપ્રયોજનં |
25 અહમ્ અવસ્થાસ્યે યુષ્માભિઃ સર્વેઃ સાર્દ્ધમ્ અવસ્થિતિં કરિષ્યે ચ
તથા ચ વિશ્વાસે યુષ્માકં વૃદ્ધ્યાનન્દૌ જનિષ્યેતે તદહં નિશ્ચિતં જાનામિ |
26 તેન ચ મત્તોડર્થતો યુષ્મત્સમીપે મમ પુનરુપસ્થિતત્વાત્ યૂયં પ્રીષ્ટેન
ચીશુના બહુતરમ્ આહ્લાદં લપ્સ્યધ્વે | 27 યૂયં સાવધાના ભૂત્વા પ્રીષ્ટસ્ય
સુસંવાદસ્યોપયુક્તમ્ આચારં કુરુધ્વં યતોડહં યુષ્માન્ ઉપાગત્ય સાક્ષાત્
કુર્વન્ કિં વા દૂરે તિષ્ઠન્ યુષ્માકં યાં વાર્તાં શ્રોતુમ્ ઇચ્છામિ સેયં યૂયમ્
એકાત્માનસ્તિષ્ઠથ, એકમનસા સુસંવાદસમ્બન્ધીયવિશ્વાસસ્ય પક્ષે યતધ્વે,
વિપક્ષેષ્ચ કેનાપિ પ્રકારેણ ન વ્યાકુલીક્રિયધ્વ ઇતિ | 28 તત્ તેષાં વિનાશસ્ય
લક્ષણં યુષ્માકઞ્ચેશ્વરદત્તં પરિત્રાણસ્ય લક્ષણં ભવિષ્યતિ | 29 યતો યેન
યુષ્માભિઃ પ્રીષ્ટે કેવલવિશ્વાસઃ ક્રિયતે તન્નહિ કિન્તુ તસ્ય કૃતે કલેશોડપિ
સહ્યતે તાદૃશો વરઃ પ્રીષ્ટસ્યાનુરોધાદ્ યુષ્માભિઃ પ્રાપિ, 30 તસ્માત્ મમ
યાદૃશં યુદ્ધં યુષ્માભિરદર્શિ સામ્પ્રતં શ્રૂયતે ચ તાદૃશં યુદ્ધં યુષ્માકમ્ અપિ
ભવતિ |

2 પ્રીષ્ટાદ્ યદિ કિમપિ સાન્ત્વનં કશ્ચિત્ પ્રેમજાતો હર્ષઃ કિન્ચિદ્ આત્મનઃ
સમભાગિત્વં કાચિદ્ અનુકમ્પા કૃપા વા જાયતે તર્હિ યૂયં મમાહ્લાદં
પૂરયન્ત 2 એકભાવા એકપ્રેમાણ એકમનસ એકચેષ્ટાશ્ચ ભવત | 3
વિરોધાદ્ દર્પાદ્ વા કિમપિ મા કુરુત કિન્તુ નમ્રતયા સ્વેભ્યોડપરાન્
વિશિષ્ટાન્ મન્યધ્વં | 4 કેવલમ્ આત્મહિતાય ન યેષ્ટમાનાઃ પરહિતાયાપિ
યેષ્ટધ્વં | 5 પ્રીષ્ટસ્ય ચીશો યાદૃશઃ સ્વભાવો યુષ્માકમ્ અપિ તાદૃશો
ભવતુ | 6 સ ઇશ્વરરૂપી સન્ સ્વકીયામ્ ઇશ્વરતુલ્યતાં શલાઘાસ્પદં
નામન્યત, 7 કિન્તુ સ્વં શૂન્યં કૃત્વા દાસરૂપી બભૂવ નરાકૃતિં લેભે ચ |

8 ઇત્યં નરમૂર્તિમ્ આશ્રિત્ય નમ્રતાં સ્વીકૃત્ય મૃત્યોરર્થતઃ કુશીયમૃત્યોરેવ
 ભોગ્યાઝાગ્રાહી બભૂવ | 9 તત્કારણાદ્ ઇશ્વરોડપિ તં સર્વોન્નતં ચકાર
 યચ્ય નામ સર્વેષાં નામ્નાં શ્રેષ્ઠં તદેવ તસ્મૈ દદૈ, 10 તતસ્તસ્મૈ યીશુનામ્ને
 સ્વર્ગમર્ત્યપાતાલસ્થિતૈઃ સર્વે જાનુપાતઃ કર્તવ્યઃ, 11 તાતસ્થેશ્વરસ્ય મહિમ્ને
 ચ યીશુખ્રીષ્ટઃ પ્રભુરિતિ જિહ્વાભિઃ સ્વીકર્તવ્યં | 12 અતો હે પ્રિયતમાઃ,
 યુષ્માભિ ર્ચદ્વત્ સર્વદા ક્રિયતે તદ્વત્ કેવલે મમોપસ્થિતિકાલે તન્નહિ
 કિન્નિવદાનીમ્ અનુપસ્થિતેડપિ મયિ બહુતરયત્નેનાઝાં ગૃહીત્વા ભયકમ્પાભ્યાં
 સ્વસ્વપરિત્રાણં સાધ્યતાં | 13 યત ઇશ્વર એવ સ્વકીયાનુરોધાદ્ યુષ્મન્મધ્યે
 મનસ્કામનાં કર્મસિદ્ધિઞ્ચ વિદધાતિ | 14 યૂયં કલહવિવાદવિજતમ્ આચારં
 કુર્વન્તોડનિન્દનીયા અકુટિલા 15 ઇશ્વરસ્ય નિષ્કલક્રુશ્ચ સન્તાનાઇવ
 વક્રભાવાનાં કુટિલાચારિણાઞ્ચ લોકાનાં મધ્યે તિષ્ઠત, 16 યતસ્તેષાં મધ્યે યૂયં
 જીવનવાક્યં ધારયન્તો જગતો દીપકા ઇવ દીપ્યધ્વે | યુષ્માભિસ્તથા કૃતે
 મમ યત્નઃ પરિશ્રમો વા ન નિષ્ફલો જાત ઇત્યહં ખ્રીષ્ટસ્ય દિને શલાઘાં કર્તું
 શક્યામિ | 17 યુષ્માકં વિશ્વાસાર્થકાય બલિદાનાય સેવનાય ચ યદ્યાપ્યહં
 નિવેદિતવ્યો ભવેયં તથાપિ તેનાનન્દામિ સર્વેષાં યુષ્માકમ્ આનન્દસ્યાંશી
 ભવામિ ચ | 18 તદ્દદ્ યૂયમપ્યાનન્દત મદીયાનન્દસ્યાંશિનો ભવત ચ |
 19 યુષ્માકમ્ અવસ્થામ્ અવગત્યાહમપિ યત્ સાન્તવનાં પ્રાપ્નુયાં તદર્થં
 તીમથિયં ત્વરયા યુષ્મત્સમીપં પ્રેષયિષ્યામીતિ પ્રભૌ પ્રત્યાશાં કુર્વે | 20 યઃ
 સત્યરૂપેણ યુષ્માકં હિતં ચિન્તયતિ તાદૃશ એકભાવસ્તસ્માદન્યઃ કોડપિ મમ
 સન્નિઘૌ નાસ્તિ | 21 યતોડપરે સર્વે યીશોઃ ખ્રીષ્ટસ્ય વિષયાન્ ન ચિન્તયન્ત
 આત્મવિષયાન્ ચિન્તયન્તિ | 22 કિન્તુ તસ્ય પરીક્ષિતત્વં યુષ્માભિ ઝાંચિતે
 યતઃ પુત્રો યાદૃક્ પિતુઃ સહકારી ભવતિ તથૈવ સુસંવાદસ્ય પરિચર્યાયાં
 સ મમ સહકારી જાતઃ | 23 અતએવ મમ ભાવિદશાં જ્ઞાત્વા તત્ક્ષણાત્
 તમેવ પ્રેષયિતું પ્રત્યાશાં કુર્વે 24 સ્વયમ્ અહમપિ તૂર્ણ યુષ્મત્સમીપં
 ગમિષ્યામીત્યાશાં પ્રભુના કુર્વે | 25 અપરં ચ ઇપાક્રુદીતો મમ ભ્રાતા
 કર્મયુદ્ધાભ્યાં મમ સહાયશ્ચ યુષ્માકં દૂતો મદીયોપકારાય પ્રતિનિધિશ્ચાસ્તિ
 યુષ્મત્સમીપે તસ્ય પ્રેષણમ્ આવશ્યકમ્ અમન્યે | 26 યતઃ સ યુષ્માન્ સર્વાન્
 અકાઙ્ક્ષત યુષ્માભિસ્તસ્ય રોગસ્ય વાર્તાશ્રાવીતિ બુદ્ધ્વા પર્યશોચચ્ય |
 27 સ પીડયા મૃતકલ્પોડભવદિતિ સત્યં કિન્તવીશ્વરસ્તં દયિતવાન્ મમ

य द्ःभात् परं पुनर्दुःभं यन्न भवेत् तदर्थं केवलं तं न दयित्वा मामपि
 दयितवान् | 28 अतश्चैव यूयं तं विलोक्य यत् पुनरानन्देत मामपि दुःभस्य
 हासो यद् भवेत् तदर्थम् अहं त्वरया तम् अप्रोषयं | 29 अतो यूयं प्रभोः
 कृते सम्पूर्णेनानन्देन तं गृह्णीत तादृशान् लोकांश्चादरणीयान् मन्यध्वं | 30
 यतो मम सेवने युष्माकं त्रुटिं पूरयितुं स प्राणान् पाणीकृत्य श्रीष्टस्य कार्यार्थं
 मृतप्रायेऽभवत् |

3 हे भ्रातरः, शेषे वदामि यूयं प्रभावानन्दतः | पुनः पुनरेकस्य वयो लेभनं
 मम क्लेशदं नहि युष्मदर्थं च भ्रमनाशकं भवति | 2 यूयं कुक्कुरेभ्यः सावधाना
 भवत कुक्कुरेभ्यः सावधाना भवत छिन्नमूलेभ्यो लोकेभ्यश्च सावधाना
 भवत | 3 वयमेव छिन्नत्वयो लोका यतो वयम् आत्मनेश्वरं सेवामहे
 श्रीष्टेन यीशुना श्लाघामहे शरीरेण य प्रगल्भतां न कुर्वामहे | 4 किन्तु
 शरीरे मम प्रगल्भतायाः कारणं विधत्ते, कश्चिद् यदि शरीरेण प्रगल्भतां
 यितीर्षति तर्हि तस्माद् अपि मम प्रगल्भताया गुरुतरं कारणं विधत्ते | 5
 यतोऽहम् अष्टमदिवसे त्वच्छेदप्राप्तं संसायेत्वंशीयो बिन्यामीनगोष्ठीय
 एब्रिकुलजात एब्रियो व्यवस्थायराणो द्विशती 6 धर्मोत्साहकारणात्
 समितेरुपद्रवकारी व्यवस्थातो लभ्ये पुण्ये यानिन्दनीयः | 7 किन्तु
 मम यद्यत् लभ्यम् आसीत् तत् सर्वम् अहं श्रीष्टस्यानुरोधात् क्षतिम्
 अमन्ये | 8 किञ्चाधुनाप्यहं मत्प्रभोः श्रीष्टस्य यीशो ज्ञानस्योत्कृष्टतां
 बुद्ध्वा तत् सर्वं क्षतिं मन्ये | 9 यतो देतोरहं यत् श्रीष्टं लभ्ये व्यवस्थातो
 जातं स्वकीयपुण्यञ्च न धारयन् किन्तु श्रीष्टे विश्वसनात् लभ्यं यत्
 पुण्यम् एश्वरेण विश्वासं दृष्ट्वा दीयते तदेव धारयन् यत् श्रीष्टे विधेय
 तदर्थं तस्यानुरोधात् सर्वेषां क्षतिं स्वीकृत्य तानि सर्वाण्यवकरानिव
 मन्ये | 10 यतो देतोरहं श्रीष्टं तस्य पुनरुत्थिते गुणं तस्य दुःभानां
 भागित्वञ्च ज्ञात्वा तस्य मृत्योराकृतिञ्च गृहीत्वा 11 येन केनचित् प्रकारेण
 मृतानां पुनरुत्थितिं प्राप्तुं यते | 12 मया तत् सर्वम् अधुना प्रापि
 सिद्धता वालम्बि तन्नाहि किन्तु यदर्थम् अहं श्रीष्टेन धारितस्तद् धारयितुं
 धावामि | 13 हे भ्रातरः, मया तद् धारितम् एति न मन्यते किन्वेतद्वैकमात्रं
 वदामि यानि पश्चात् स्थितानि तानि विस्मृत्याहम् अग्रस्थितान्युद्दिश्य
 14 पूर्णयत्नेन लक्ष्यं प्रति धावन् श्रीष्टयीशुनोर्द्वधात् माम् आह्वयत

ઈશ્વરાત્ જેતૃપણં પ્રાપ્તું ચેષ્ટે | 15 અસ્માકં મધ્યે યે સિદ્ધાસ્તૈઃ સર્વૈસ્તદેવ
ભાવ્યતાં, યદિ ચ કચ્ચન વિષયમ્ અધિ યુષ્માકમ્ અપરો ભાવો ભવતિ
તર્હીશ્વરસ્તમપિ યુષ્માકં પ્રતિ પ્રકાશયિષ્યતિ | 16 કિન્તુ વયં યદદ્ અવગતા
આસ્મસ્તત્રાસ્માભિરેકો વિધિરાચરિતવ્ય એકભાવૈ ભવિતવ્યચ્ચ | 17 હે
ભ્રાતરઃ, યૂયં મમાનુગામિનો ભવત વચચ્ચ યાદૃગાચરણસ્ય નિદર્શનસ્વરૂપા
ભવામસ્તાદૃગાચારિણો લોકાન્ આલોકયધ્વં | 18 યતોડનેકે વિપથે ચરન્તિ
તે ચ ખ્રીષ્ટસ્ય ક્રુશસ્ય શત્રવ ઇતિ પુરા મયા પુનઃ પુનઃ કથિતમ્ અધુનાપિ
રુદતા મયા કથ્યતે | 19 તેષાં શેષદશા સર્વનાશ ઉદરશ્ચેશ્વરો લજ્જા
ચ શ્લાઘા પૃથિવ્યાચ્ચ લગ્નં મનઃ | 20 કિન્ત્વસ્માકં જનપદઃ સ્વર્ગે વિધતે
તસ્માચ્યાગમિષ્યન્તં ત્રાતારં પ્રભું યીશુખ્રીષ્ટં વયં પ્રતીક્ષામહે | 21 સ ચ યયા
શકત્યા સર્વ્વાણ્યેવ સ્વસ્ય વશીકર્તુ પારયતિ તયાસ્માકમ્ અધમં શરીરં
રૂપાન્તરીકૃત્ય સ્વકીયતેજોમયશરીરસ્ય સમાકારં કરિષ્યતિ |

4 હે મદીયાનન્દમુકુટસ્વરૂપાઃ પ્રિયતમા અભીષ્ટતમા ભ્રાતરઃ, હે મમ
સ્નેહપાત્રાઃ, યૂયમ્ ઇત્યં પભૌ સ્થિરાસ્તિષ્ઠત | 2 હે ઇવદિયે હે સુન્તુખિ યુવાં
પ્રભૌ એકભાવે ભવતમ્ એતદ્ અહં પ્રાર્થયે | 3 હે મમ સત્ય સહકારિન્
ત્વામપિ વિનીય વદામિ એતયોરુપકારસ્ત્વયા ક્રિયતાં યતસ્તે કલીમિનાદિભિઃ
સહકારિભિઃ સાર્દ્ધં સુસંવાદપ્રચારણાય મમ સાહાય્યાર્થં પરિશ્રમમ્ અકુર્વતાં
તેષાં સર્વેષાં નામાનિ ચ જીવનપુસ્તકે લિખિતાનિ વિધન્તે | 4 યૂયં
પ્રભૌ સર્વદાનન્દત | પુન વદામિ યૂયમ્ આનન્દત | 5 યુષ્માકં વિનીતત્વં
સર્વમાનવૈ જ્ઞાયતાં, પ્રભુઃ સન્નિઘૌ વિધતે | 6 યૂયં કિમપિ ન ચિન્તયત કિન્તુ
ધન્યવાદયુક્તાભ્યાં પ્રાર્થનાયાચ્ચાભ્યાં સર્વવિષયે સ્વપ્રાર્થનીયમ્ ઇશ્વરાય
નિવેદયત | 7 તથા કૃત ઇશ્વરીયા યા શાન્તિઃ સર્વા બુદ્ધિમ્ અતિશેતે સા
યુષ્માકં ચિત્તાનિ મનાંસિ ચ ખ્રીષ્ટે યીશૌ રક્ષિષ્યતિ | 8 હે ભ્રાતરઃ, શેષે
વદામિ યદ્યત્ સત્યમ્ આદરણીયં ન્યાય્યં સાધુ પ્રિયં સુખ્યાતમ્ અન્યેણ
યેન કેનચિત્ પ્રકારેણ વા ગુણયુક્તં પ્રશંસનીયં વા ભવતિ તત્રૈવ મનાંસિ
નિધધ્વં | 9 યૂયં માં દૃષ્ટ્વા શ્રુત્વા ચ યદ્યત્ શિક્ષિતવન્તો ગૃહીતવન્તશ્ચ
તદેવાચરત તસ્માત્ શાન્તિદાયક ઇશ્વરો યુષ્માભિઃ સાર્દ્ધં સ્થાસ્યતિ | 10
મમોપકારાય યુષ્માકં યા ચિન્તા પૂર્વમ્ આસીત્ કિન્તુ કર્મદ્વારં ન પ્રાપ્નોત્
ઇદાનીં સા પુનરફલત્ ઇત્યસ્મિન્ પ્રભૌ મમ પરમાહ્વાદોડજાયત | 11 અહં

યદ્ દૈન્યકારણાદ્ ઇદં વદામિ તન્નહિ યતો મમ યા કાચિદ્ અવસ્થા ભવેત્
 તસ્યાં સન્તોષ્ટુમ્ અશિક્ષયં | 12 દરિદ્રતાં ભોક્તું શક્નોમિ ધનાઢ્યતામ્ અપિ
 ભોક્તું શક્નોમિ સર્વથા સર્વવિષયેષુ વિનીતોડદં પ્રચુરતાં ક્ષુધાઞ્ચ ધનં
 દૈન્યઞ્ચાવગતોડસ્મિ | 13 મમ શક્તિદાયકેન ખ્રીષ્ટેન સર્વમેવ મયા શક્યં
 ભવતિ | 14 કિન્તુ યુષ્માભિ દૈન્યનિવારણાય મામ્ ઉપકૃત્ય સત્કર્માકારિ |
 15 હે ક્ષિલિપીયલોકાઃ, સુસંવાદસ્યોદયકાલે યદાહં માકિદનિયાદેશાત્ પ્રતિષ્ઠે
 તદા કેવલાન્ યુષ્માન્ વિનાપરયા કયાપિ સમિત્યા સહ દાનાદાનયો મમ
 કોડપિ સમ્બન્ધો નાસીદ્ ઇતિ યૂયમપિ જાનીથ | 16 યતો યુષ્માભિ મમ
 પ્રયોજનાય શિષલનીકીનગરમપિ માં પ્રતિ પુનઃ પુનર્દાનં પ્રેષિતં | 17 અહં યદ્
 દાનં મૃગયે તન્નહિ કિન્તુ યુષ્માકં લાભવદ્ધકં ફલં મૃગયે | 18 કિન્તુ મમ
 કસ્યાપ્યભાવો નાસ્તિ સર્વ્યં પ્રચુરમ્ આસ્તે યત ઇશ્વરસ્ય ગ્રાહ્યં તુષ્ટિજનકં
 સુગન્ધિનૈવેધસ્વરૂપં યુષ્માકં દાનં ઇપાઠ્ઠિતાદ્ ગૃહીત્વાહં પરિતૃપ્તોડસ્મિ | 19
 મમૈશ્વરોડપિ ખ્રીષ્ટેન યીશુના સ્વકીયવિભવનિધિતઃ પ્રયોજનીયં સર્વવિષયં
 પૂર્ણરૂપં યુષ્મભ્યં દેયાત્ | 20 અસ્માકં પિતુરીશ્વરસ્ય ધન્યવાદોડનન્તકાલં
 યાવદ્ ભવતુ | આમેન્ | (aiñ g165) 21 યૂયં યીશુખ્રીષ્ટસ્યૈકેકં પવિત્રજનં
 નમસ્કુરુત | મમ સક્ષિભ્રાતરો યૂષ્માન્ નમસ્કુર્વ્યતે | 22 સર્વ્યે પવિત્રલોકા
 વિશેષતઃ કૈસરસ્ય પરિજના યુષ્માન્ નમસ્કુર્વ્યતે | 23 અસ્માકં પ્રભો
 ર્થીશુખ્રીષ્ટસ્ય પ્રસાદઃ સર્વાન્ યુષ્માન્ પ્રતિ ભૂયાત્ | આમેન્ |

कलसिनः

1 ईश्वरस्येच्छया यीशुप्रीष्टस्य प्रेरितः पौलस्तीमथियो ब्राता य
कलसीनगरस्थान् पवित्रान् विश्वस्तान् प्रीष्टाश्रितब्रातृन् प्रति पत्रं लिखतः |
2 अस्माकं तात ईश्वरः प्रभु र्यीशुप्रीष्टश्च युष्मान् प्रति प्रसादं शान्तिञ्च
क्रियास्तां | 3 प्रीष्टे यीशौ युष्माकं विश्वासस्य सर्वान् पवित्रलोकान् प्रति
प्रेम्नश्च वार्तां श्रुत्वा 4 वयं सदा युष्मदर्थं प्रार्थनां कुर्वन्तः स्वर्गं निहिताया
युष्माकं भाविसम्पदः कारणात् स्वकीयप्रभो र्यीशुप्रीष्टस्य तातम् ईश्वरं धन्यं
वदामः | 5 यूयं तस्या भाविसम्पदो वार्तां यथा सुसंवाद्गुण्यया सत्यवाण्या
ज्ञापिताः 6 सा यद्दत्तं कृत्स्नं जगद् अभिगच्छति तद्दत्तं युष्मान् अप्यभ्यगमत्
यूयञ्च यद् दिनम् आरभ्येश्वरस्यानुग्रहस्य वार्तां श्रुत्वा सत्यरूपेण
ज्ञातवन्तस्तदारभ्य युष्माकं मध्येऽपि इलति वर्द्धते य | 7 अस्माकं प्रियः
सडदासो युष्माकं कृते य प्रीष्टस्य विश्वस्तपरिचारको य षपद्वास्तद् वाक्यं 8
युष्मान् आदिष्टवान् स अवास्मान् आत्मना जनितं युष्माकं प्रेम ज्ञापितवान् |
9 वयं यद् दिनम् आरभ्य तां वार्तां श्रुतवन्तस्तदारभ्य निरन्तरं युष्माकं
कृते प्रार्थनां कुर्मः इलतो यूयं यत् पूर्वाभ्याम् आत्मिकज्ञानवुद्धिभ्याम्
ईश्वरस्याभितमं सम्पूर्णांरूपेणावगच्छेत, 10 प्रभो र्योग्यं सर्वथा
सन्तोषजनकआचारं कुर्यात्तार्थत ईश्वरज्ञाने वर्द्धमानाः सर्वसत्कर्मरूपं इलं
इलेत, 11 यथा येश्वरस्य मडिमयुक्तया शक्त्या सानन्देन पूर्णां सडिषगुतां
तितिक्षाआयरितुं शक्षयथ तादृशेन पूर्णबलेन यद् बलवन्तो भवेत, 12 यश्च
पिता तेजोवासिनां पवित्रलोकानाम् अधिकारस्यांशित्वायास्मान् योग्यान्
कृतवान् तं यद् धन्यं वदेत वरम् अनेन यायामडे | 13 यतः सोऽस्मान्
तिमिरस्य कर्तृत्वाद् उद्धृत्य स्वकीयस्य प्रियपुत्रस्य राज्ये स्थापितवान् |
14 तस्मात् पुत्राद् वयं परित्राणाम् अर्थतः पापमोचनं प्राप्तवन्तः | 15 स
यादृश्यस्येश्वरस्य प्रतिमूर्तिः कृत्स्नायाः सृष्टेरादिकर्ता य | 16 यतः सर्वमेव
तेन ससृष्टे सिंहासनराजत्वपराक्रमादीनि स्वर्गमर्त्यस्थितानि दृश्यादृश्यानि
वस्तूनि सर्वाणि तेनैव तस्मै य ससृष्टिरे | 17 स सर्वेषाम् आदिः सर्वेषां
स्थितिकारकश्च | 18 स अेव समितिःरूपायास्तनो भूर्द्धा किञ्च सर्वविषये स
यद् अग्रियो भवेत् तदर्थं स अेव मृतानां मध्यात् प्रथमत उत्थितोऽग्रश्च |
19 यत ईश्वरस्य कृत्स्नं पूर्णत्वं तमेवावासयितुं 20 कुशे पातितेन तस्य

રક્તેન સન્ધિં વિધાય તેનૈવ સ્વર્ગમર્ત્યસ્થિતાનિ સર્વાણિ સ્વેન સહ
 સન્ધાપયિતુન્નેશ્વરેણાભિલેષે | 21 પૂર્વ દૂરસ્થા દુષ્ટિચારતમનસ્કત્વાત્
 તસ્ય રિપવશ્રાસ્ત યે યૂયં તાન્ યુષ્માન્ અપિ સ ઇદાનીં તસ્ય માંસલશરીરે
 મરણેન સ્વેન સહ સન્ધાપિતવાન્ | 22 યતઃ સ સ્વસમ્મુખે પવિત્રાન્
 નિષ્કલઙ્કાન્ અનિન્દનીયાંશ્ચ યુષ્માન્ સ્થાપયિતુમ્ ઇચ્છતિ | 23 કિન્ત્વેતદર્થં
 યુષ્માભિ ભદ્રમૂલૈઃ સુસ્થિરૈશ્ચ ભવિતવ્યમ્ આકાશમાણ્ડલસ્યાધઃસ્થિતાનાં
 સર્વલોકાનાં મધ્યે ય ઘુષ્યમાણો યઃ સુસંવાદો યુષ્માભિરશ્રાવિ તજ્જાતાયાં
 પ્રત્યાશાયાં યુષ્માભિરયલૈ ભવિતવ્યં | 24 તસ્ય સુસંવાદસ્યૈકઃ પરિચારકો
 યોડહં પૌલઃ સોડહમ્ ઇદાનીમ્ આનન્દેન યુષ્મદર્થં દુઃખાનિ સહૈ પ્રીષ્ટસ્ય
 ક્લેશભોગસ્ય યોશોડપૂર્ણસ્તમેવ તસ્ય તનોઃ સમિતેઃ કૃતે સ્વશરીરે પૂરયામિ
 ય | 25 યત ઇશ્વરસ્ય મન્ત્રણયા યુષ્મદર્થમ્ ઇશ્વરીયવાક્યસ્ય પ્રચારસ્ય
 ભારો મયિ સમપિતસ્તસ્માદ્ અહં તસ્યાઃ સમિતેઃ પરિચારકોડભવં | 26 તત્
 નિગૂઢં વાક્યં પૂર્વયુગેષુ પૂર્વપુરુષેભ્યઃ પ્રચ્છન્નમ્ આસીત્ કિન્ત્વિદાનીં
 તસ્ય પવિત્રલોકાનાં સન્નિધૌ તેન પ્રાકાશ્યત | (aiōn g165) 27 યતો
 ભિન્નજાતીયાનાં મધ્યે તત્ નિગૂઢવાક્યં કીદૃગૌરવનિધિસમ્બલિતં તત્
 પવિત્રલોકાન્ જ્ઞાપયિતુમ્ ઇશ્વરોડભ્યલષત્ | યુષ્મન્મધ્યવર્તી પ્રીષ્ટ એવ સ
 નિધિ ગૈરવાશાભૂમિશ્ચ | 28 તસ્માદ્ વયં તમેવ ઘોષયન્તો યદ્ એકૈકં માનવં
 સિદ્ધીભૂતં પ્રીષ્ટે સ્થાપયેમ તદર્થમેકૈકં માનવં પ્રબોધયામઃ પૂર્ણજ્ઞાનેન ચૈકૈકં
 માનવં ઉપદિશામઃ | 29 એતદર્થં તસ્ય યા શક્તિઃ પ્રબલરૂપેણ મમ મધ્યે
 પ્રકાશતે તયાહં યતમાનઃ શ્રાભ્યામિ |

2 યુષ્માકં લાયદિકેયાસ્થભ્રાતૃણાઞ્ચ કૃતે યાવન્તો ભ્રાતરશ્ચ મમ શારીરિકમુખં
 ન દૃષ્ટવન્તસ્તેષાં કૃતે મમ કિયાન્ યન્તો ભવતિ તદ્ યુષ્માન્ જ્ઞાપયિતુમ્
 ઇચ્છામિ | 2 ક્વલતઃ પૂર્ણબુદ્ધિરૂપધનભોગાય પ્રેમ્ના સંયુક્તાનાં તેષાં
 મનાંસિ યત્ પિતુરીશ્વરસ્ય પ્રીષ્ટસ્ય ય નિગૂઢવાક્યસ્ય જ્ઞાનાર્થં સાન્ત્વનાં
 પ્રાપ્નુયુરિત્યર્થમહં યતે | 3 યતો વિદ્યાજ્ઞાનયોઃ સર્વે નિધયઃ પ્રીષ્ટે ગુપ્તાઃ
 સન્તિ | 4 કોડપિ યુષ્માન્ વિનયવાક્યેન યન્ન વચ્ચેત્ તદર્થમ્ એતાનિ મયા
 કથ્યન્તે | 5 યુષ્મત્સન્નિધૌ મમ શરીરેડવર્તમાનેડપિ મમાત્મા વર્તતે તેન
 યુષ્માકં સુરીતિં પ્રીષ્ટવિશ્વાસે સ્થિરત્વઞ્ચ દૃષ્ટ્વાહમ્ આનન્દામિ | 6 અતો
 યૂયં પ્રભું યીશુપ્રીષ્ટં યાદૃગ્ ગૃહીતવન્તસ્તાદૃક્ તમ્ અનુચરત | 7 તસ્મિન્

બદ્ધમૂલાઃ સ્થાપિતાશ્ચ ભવત યા ચ શિક્ષા યુષ્માભિ લ્બધ્વા તદનુસારાદ્
 વિશ્વાસે સુસ્થિરાઃ સન્તસ્તેનૈવ નિત્યં ધન્યવાદં કુરુત | 8 સાવધાના ભવત
 માનુષિકશિક્ષાત ઇલોકસ્ય વાર્ણમાલાતશ્ચોત્પન્ના પ્ત્રીષ્ટસ્ય વિપક્ષા યા
 દર્શનવિદ્યા મિથ્યાપ્રતારણા ચ તથા કોડપિ યુષ્માકં ક્ષતિં ન જનયતુ | 9
 યત ઈશ્વરસ્ય કૃત્સ્ના પૂર્ણતા મૂર્તિમતી પ્ત્રીષ્ટે વસતિ | 10 યૂયઞ્ચ તેન
 પૂર્ણા ભવથ યતઃ સ સર્વેષાં રાજત્વકર્તૃત્વપદાનાં મૂર્દ્ધાસ્તિ, 11 તેન ચ
 યૂયમ્ અહસ્તકૃતત્વક્ષેદેનાર્થતો યેન શારીરપાપાનાં વિગ્રસત્યજ્યતે તેન
 પ્ત્રીષ્ટસ્ય ત્વક્ષેદેન છિન્નત્વયો જાતા 12 મજ્જને ચ તેન સાદ્ધ્મ્ શ્મશાનં
 પ્રાપ્તાઃ પુન મૃતાનાં મધ્યાત્ તસ્યોત્થાપયિતુરીશ્વરસ્ય શક્તેઃ ફલં યો
 વિશ્વાસસ્તદ્વારા તસ્મિન્નેવ મજ્જને તેન સાદ્ધ્મ્ ઉત્થાપિતા અભવત |
 13 સ ચ યુષ્માન્ અપરાધૈઃ શારીરિકાત્વક્ષેદેન ચ મૃતાન્ દૃષ્ટ્વા તેન સાદ્ધ્મ્
 જીવિતવાન્ યુષ્માકં સર્વાન્ અપરાધાન્ ક્ષમિતવાન્, 14 યચ્ચ દાણ્ડાજ્ઞાણં
 ઋણપત્રમ્ અસ્માકં વિરુદ્ધમ્ આસીત્ તત્ પ્રમાજિર્જિતવાન્ શલાકાભિઃ કુશે
 બદ્ધ્વા દૂરીકૃતવાંશ્ચ | 15 કિઞ્ચ તેન રાજત્વકર્તૃત્વપદાનિ નિસ્તેજાંસિ કૃત્વા
 પરાજિતાન્ રિપૂનિવ પ્રગલ્ભતયા સર્વેષાં દૃષ્ટિગોચરે હેપિતવાન્ | 16 અતો
 હેતોઃ ખાધાખાધે પેયાપેયે ઉત્સવઃ પ્રતિપદ્ વિશ્રામવારશ્ચૈતેષુ સર્વેષુ યુષ્માકં
 ન્યાયાધિપતિરૂપં કમપિ મા ગૃહ્ણીત | 17 યત એતાનિ છાયાસ્વરૂપાણિ
 કિન્તુ સત્યા મૂર્તિઃ પ્ત્રીષ્ટઃ | 18 અપરઞ્ચ નમ્રતા સ્વર્ગદૂતાનાં સેવા ચૈતાદૃશમ્
 ઇષ્ટકર્માચરન્ યઃ કશ્ચિત્ પરોક્ષવિષયાન્ પ્રવિશતિ સ્વકીયશારીરિકભાવેન
 ચ મુધા ગર્વિતઃ સન્ 19 સન્ધિભિઃ શિરાભિશ્ચોપકૃતં સંયુક્તઞ્ચ કૃત્સ્નં
 શરીરં યસ્માત્ મૂર્દ્ધત ઈશ્વરીયવૃદ્ધિ પ્રાપ્નોતિ તં મૂર્દ્ધાનં ન ધારયતિ તેન
 માનવેન યુષ્મત્તઃ ફલાપહરણં નાનુજાનીત | 20 યદિ યૂયં પ્ત્રીષ્ટેન સાદ્ધ્મ્
 સંસારસ્ય વાર્ણમાલાયૈ મૃતા અભવત તર્હિ ચૈ દ્રવ્યૈ ભોગેન ક્ષયં ગન્તવ્યં
 21 તાનિ મા સ્પૃશ મા ભુંક્ષ્વ મા ગૃહ્ણાણોતિ માનવૈરાદિષ્ટાન્ શિક્ષિતાંશ્ચ
 વિધીન્ 22 આચરન્તો યૂયં કુતઃ સંસારે જીવન્ત ઈવ ભવથ? 23 તે વિધયઃ
 સ્વેચ્છાભક્ત્યા નમ્રતયા શરીરકલેશનેન ચ જ્ઞાનવિધિવત્ પ્રકાશન્તે તથાપિ
 તેડગણ્યાઃ શારીરિકભાવવદ્ધકાશ્ચ સન્તિ |

3 યદિ યૂયં પ્ત્રીષ્ટેન સાદ્ધ્મ્ ઉત્થાપિતા અભવત તર્હિ યસ્મિન્ સ્થાને પ્ત્રીષ્ટ
 ઈશ્વરસ્ય દક્ષિણપાશ્વે ઉપવિષ્ટ આસ્તે તસ્યોર્દ્ધ્વસ્થાનસ્ય વિષયાન્

येष्टध्वं | 2 पार्थिवविषयेषु न यतमाना उर्ध्वस्थविषयेषु यतध्वं | 3 यतो यूयं
 भृतवन्तो युष्माकं श्रुवितञ्च श्रीष्टेन सार्द्धम् एश्वरे गुप्तम् अस्ति | 4 अस्माकं
 श्रुवनस्वऋषः श्रीष्टो यदा प्रकाशिष्यते तदा तेन सार्द्धं यूयमपि विभवेन
 प्रकाशिष्यध्वे | 5 अतो वेश्यागमनम् अशुचिक्रिया रागः कुत्सिताभिलाषो
 देवपूजातुल्यो लोभश्चैतानि पार्थवपुरुषस्याङ्गानि युष्माभिर्निहन्यन्तां | 6
 यत अतेभ्यः कर्मभ्य आज्ञालङ्घिनो लोकान् प्रतीश्वरस्य क्रोधो वर्तते | 7
 पूर्वं यदा यूयं तान्युपाश्रुवत तदा यूयमपि तान्येवाचरतः | 8 किन्त्विदानीं क्रोधो
 रोषो जिहिसिषा दुर्भुजता वदननिर्गतकटाक्षपश्चैतानि सर्वाणि दूरीकुरुध्वं |
 9 यूयं परस्परं मृषाकथां न वदत यतो यूयं स्वकर्मसहितं पुरातनपुरुषं
 त्यक्तवन्तः | 10 स्वसृष्टुः प्रतिमूर्त्या तत्त्वज्ञानाय नूतनीकृतं नवीनपुरुषं
 परिहितवन्तश्च | 11 तेन य यिदूदित्मिन्नजातीययोश्छिन्नत्वगच्छिन्नत्वयो
 भ्रंशश्चकुथीययो दसिमुक्तयोश्च कोऽपि विशेषो नास्ति किन्तु सर्वेषु सर्वः
 श्रीष्ट अवास्ते | 12 अतश्च यूयम् एश्वरस्य मनोभिलषिताः पवित्राः
 प्रियाश्च लोका एव स्नेहयुक्ताम् अनुकम्पां हितैषितां नम्रतां तितिक्षां
 सदिष्युताञ्च परिधदध्वं | 13 यूयम् अकैकस्याचरणं सलध्वं येन य यस्य
 किमप्यपराध्यते तस्य तं दोषं स क्षमतां, श्रीष्टो युष्माकं दोषान् यद्वद्
 क्षमितवान् यूयमपि तद्वत् कुरुध्वं | 14 विशेषतः सिद्धिजनकेन प्रेमबन्धनेन
 बद्धा भवत | 15 यस्याः प्राप्तये यूयम् अकस्मिन् शरीरे समाहूता अभवत
 शेषरीया शान्तिं युष्माकं मनांस्यधितिष्ठतु यूयञ्च कृतज्ञा भवत | 16
 श्रीष्टस्य वाक्यं सर्वविधज्ञानाय सम्पूर्णरूपेण युष्मदन्तरे निवमतु, यूयञ्च
 गीतैर्गानैः पारमार्थिकसङ्गीर्तनैश्च परस्परम् आदिशत प्रबोधयत य,
 अनुगृहीतत्वात् प्रभुम् उद्दिश्य स्वमनोभिर्गायत य | 17 वाया कर्माणा
 वा यद् यत् कुरुत तत् सर्वं प्रभो र्यीशो नान्ना कुरुत तेन पितरम् एश्वरं
 धन्यं वदत य | 18 हे योषितः, यूयं स्वामिनां वश्या भवत यतस्तदेव
 प्रभवे रोयते | 19 हे स्वामिनः, यूयं भार्यासु प्रीयध्वं ताः प्रति परुषालापं
 मा कुरुध्वं | 20 हे भालाः, यूयं सर्वविषये पित्रोराज्ञाग्राहिणो भवत
 यतस्तदेव प्रभोः सन्तोषजनकं | 21 हे पितरः, युष्माकं सन्ताना यत् कातरा
 न भवेयुस्तदर्थं तान् प्रति मा रोषयत | 22 हे दासाः, यूयं सर्वविषय
 अहिकप्रभूनाम् आज्ञाग्राहिणो भवत दृष्टिगोचरीयसेवया मानवेभ्यो

રોચિતું મા યતદ્યં કિન્તુ સરલાન્તઃકરણૈઃ પ્રભો ભાત્યા કાર્ય્યં કુરુધ્વં | 23
 યચ્ચ કુરુધ્વે તત્ માનુષમનુદિશ્ય પ્રભુમ્ ઉદિશ્ય પ્રકુલમનસા કુરુધ્વં, 24
 યતો વયં પ્રભુતઃ સ્વર્ગાધિકારરૂપં ફલં લપ્સ્યામહ ઇતિ યૂયં જાનીથ યસ્માદ્
 યૂયં પ્રભોઃ પ્રીષ્ટસ્ય દાસા ભવથ | 25 કિન્તુ યઃ કશ્ચિદ્ અનુચિતં કર્મ કરોતિ
 સ તસ્યાનુચિતકર્મણઃ ફલં લપ્સ્યતે તત્ર કોડપિ પક્ષપાતો ન ભવિષ્યતિ |

4 અપરઞ્ચ હે અધિપતયઃ, યૂયં દાસાન્ પ્રતિ ન્યાય્યં યથાર્થઞ્ચારણં કુરુધ્વં
 યુષ્માકમપ્યેકોડધિપતિઃ સ્વર્ગે વિધત ઇતિ જાનીત | 2 યૂયં પ્રાર્થનાયાં
 નિત્યં પ્રવર્તધ્વં ધન્યવાદં કુર્વન્તસ્તત્ર પ્રબુદ્ધાસ્તિષ્ઠત ચ | 3 પ્રાર્થનાકાલે
 મમાપિ કૃતે પ્રાર્થનાં કુરુધ્વં, 4 ફલતઃ પ્રીષ્ટસ્ય યન્નિગૂઢવાક્યકારણાદ્
 અહં બદ્ધોડભવં તત્રકાશાયેશ્વરો યત્ મદર્થં વાગ્દ્વારં કુર્યાત્, અહઞ્ચ
 યથોચિતં તત્ પ્રકાશયિતું શક્નુયામ્ એતત્ પ્રાર્થયધ્વં | 5 યૂયં સમયં
 બહુમૂલ્યં જ્ઞાત્વા બહિઃસ્થાન્ લોકાન્ પ્રતિ જ્ઞાનાચારં કુરુધ્વં | 6 યુષ્માકમ્
 આલાપઃ સર્વ્વદાનુગ્રહસૂચકો લવણેન સુસ્વાદુશ્ચ ભવતુ યસ્મૈ યદુત્તરં
 દાતવ્યં તદ્ યુષ્માભિરવગમ્યતાં | 7 મમ યા દશાક્તિ તાં તુષ્કિનામા
 પ્રભૌ પ્રિયો મમ ભ્રાતા વિશ્વસનીયઃ પરિચારકઃ સહદાસશ્ચ યુષ્માન્
 જ્ઞાપયિષ્યતિ | 8 સ યદ્ યુષ્માકં દશાં જાનીયાત્ યુષ્માકં મનાંસિ સાન્ત્વયેચ્ચ
 તદર્થમેવાહં 9 તમ્ ઓનીષિમનામાનઞ્ચ યુષ્મદ્દેશીયં વિશ્વસ્તં પ્રિયઞ્ચ
 ભ્રાતરં પ્રેષિતવાન્ તૌ યુષ્માન્ અત્રત્યાં સર્વ્વવાર્તાં જ્ઞાપયિષ્યતઃ | 10
 આરિષ્ટાર્ષનામા મમ સહબન્દી બર્ણબ્બા ભાગિનેયો માર્કો યુષ્ટનામ્ના
 વિષ્યાતો યીશુશ્ચૈતે છિન્નત્વયો ભ્રાતરો યુષ્માન્ નમસ્કારં જ્ઞાપયન્તિ, તેષાં
 મધ્યે માર્કમધિ યૂયં પૂર્વ્વમ્ આજ્ઞાપિતાઃ સ યદિ યુષ્મત્સમીપમ્ ઉપતિષ્ઠેત્
 તર્હિ યુષ્માભિ ગૃહ્યતાં | 11 કેવલમેત ઈશ્વરરાજ્યે મમ સાન્ત્વનાજનકાઃ
 સહકારિણોડભવન્ | 12 પ્રીષ્ટસ્ય દાસો યો યુષ્મદ્દેશીય ઇપક્ષ્ઠાઃ સ યુષ્માન્
 નમસ્કારં જ્ઞાપયતિ યૂયઞ્ચેશ્વરસ્ય સર્વ્વસ્મિન્ મનોડભિલાષે યત્ સિદ્ધાઃ
 પૂર્ણાશ્ચ ભવેત તદર્થં સ નિત્યં પ્રાર્થનયા યુષ્માકં કૃતે યતતે | 13 યુષ્માકં
 લાયદિકેયાસ્થિતાનાં હિયરાપલિસ્થિતાનાઞ્ચ ભ્રાતૃણાં હિતાય સોડતીવ
 યેષ્ટત ઇત્યસ્મિન્ અહં તસ્ય સાક્ષી ભવામિ | 14 લૂકનામા પ્રિયશ્ચિકિત્સકો
 દીમાશ્ચ યુષ્મત્યં નમસ્કુર્વાતે | 15 યૂયં લાયદિકેયાસ્થાન્ ભ્રાતૃન્ નુમ્ફાં
 તદ્ગૃહસ્થિતાં સમિતિઞ્ચ મમ નમસ્કારં જ્ઞાપયત | 16 અપરં યુષ્મત્સન્નિધૌ

पत्रस्यास्य पाठे कृते लायटिकेयास्थसमितावपि तस्य पाठो यथा भवेत्
लायटिकेयाञ्च यत् पत्रं मया प्रहितं तद् यथा युष्माभिरपि पठयेत तथा
येष्टध्वं | 17 अपरम् आर्षिष्णं वदत प्रभो र्यत् परियर्यापदं त्वयाप्रापि
तत्साधनाय सावधानो भव | 18 अहं पौलः स्वहस्ताक्षरेण युष्मान्
नमस्कारं ज्ञापयामि यूयं मम बन्धनं स्मरत | युष्मान् प्रत्यनुग्रहो भूयात् |
आमेन |

૧ થિષલનીકિન:

1 પૌલ: સિલ્વાનસ્તીમથિયશ્ચ પિતુરીશ્વરસ્ય પ્રભો ર્થીશુપ્રીષ્ટસ્ય યાશ્રયં પ્રાપ્તા થિષલનીકીયસમિતિં પ્રતિ પત્રં લિખન્તિ | અસ્માકં તાત ઈશ્વર: પ્રભુ ર્થીશુપ્રીષ્ટશ્ચ યુષ્માન્ પ્રત્યનુગ્રહં શાન્તિઞ્ચ ક્રિયાસ્તાં | 2 વયં સર્વેષાં યુષ્માકં કૃતે ઈશ્વરં ધન્યં વદામ: પ્રાર્થનાસમયે યુષ્માકં નામોચ્ચારયામઃ, 3 અસ્માકં તાતસ્યેશ્વરસ્ય સાક્ષાત્ પ્રભૌ યીશુપ્રીષ્ટે યુષ્માકં વિશ્વાસેન યત્ કાર્યં પ્રેમ્ના ય: પરિશ્રમ: પ્રત્યાશયા ય યા તિતિક્ષા જાયતે 4 તત્ સર્વ્યં નિરન્તરં સ્મરામશ્ચ | હે પિયભ્રાતર:, યૂયમ્ ઈશ્વરેણાભિરુચિતા લોકા ઇતિ વયં જાનીમઃ | 5 યતોડસ્માકં સુસંવાદઃ કેવલશબ્દેન યુષ્માન્ ન પ્રવિશ્ય શક્ત્યા પવિત્રેણાત્મના મહોત્સાહેન ય યુષ્માન્ પ્રાવિશત્ | વયન્તુ યુષ્માકં કૃતે યુષ્મન્મધ્યે કીદૃશા અભવામ તદ્ યુષ્માભિ જ્ઞાયાતે | 6 યૂયમપિ બહુકલેશભોગેન પવિત્રેણાત્મના દત્તેનાનન્દેન ય વાક્યં ગૃહીત્વાસ્માકં પ્રભોશ્ચાનુગામિનોડભવત | 7 તેન માકિદનિયાખાયાદેશયો ર્યાવન્તો વિશ્વાસિનો લોકા: સન્તિ યૂયં તેષાં સર્વેષાં નિદર્શનસ્વરૂપા જાતા: | 8 યતો યુષ્મત્ત: પ્રતિનાદિતયા પ્રભો વાંણ્યા માકિદનિયાખાયાદેશૌ વ્યાપ્તૌ કેવલમેતન્નહિ કિન્વીશ્વરે યુષ્માકં યો વિશ્વાસસ્તસ્ય વાર્તા સર્વત્રાશ્રાવિ, તસ્માત્ તત્ર વાક્યકથનમ્ અસ્માકં નિષ્પ્રયોજનં | 9 યતો યુષ્મન્મધ્યે વયં કીદૃશં પ્રવેશં પ્રાપ્તા યૂયન્ન કથં પ્રતિમા વિહાયેશ્વરં પ્રત્યાવર્તધ્વમ્ અમરં સત્યમીશ્વરં સેવિતું 10 મૃતગણમધ્યાચ્ય તેનોત્થાપિતસ્ય પુત્રસ્યાર્થત આગામિકોઘાદ્ અસ્માકં નિસ્તારયિતુ ર્થીશો: સ્વર્ગાદ્ આગમનં પ્રતીક્ષિતુમ્ આરભધ્વમ્ એતત્ સર્વ્યં તે લોકા: સ્વયમ્ અસ્માન્ જ્ઞાપયન્તિ |

2 હે ભ્રાતર:, યુષ્મન્મધ્યે ડસ્માકં પ્રવેશો નિષ્ફલો ન જાત ઇતિ યૂયં સ્વયં જાનીથ | 2 અપરં યુષ્માભિ ર્થથાશ્રાવિ તથા પૂર્વ્યં ફિલિપીનગરે ક્લિષ્ટા નિન્દિતાશ્ચ સન્તોડપિ વયમ્ ઈશ્વરાદ્ ઉત્સાહં લબ્ધ્વા બહુયત્નેન યુષ્માન્ ઈશ્વરસ્ય સુસંવાદમ્ અબોધયામ | 3 યતોડસ્માકમ્ આદેશો ભ્રાન્તેરશુચિભાવાદ્ વોત્પન્ન: પ્રવન્નનાયુક્તો વા ન ભવતિ | 4 કિન્વીશ્વરેણાસ્માન્ પરીક્ષ્ય વિશ્વસનીયાન્ મત્વા ય યદ્વત્ સુસંવાદોડસ્માસુ સમાર્પ્યત તદ્દદ્ વયં માનવેભ્યો ન રુરોચિષમાણા: કિન્વસ્મદન્ત:કરણાનાં પરીક્ષકાયેશ્વરાય રુરોચિષમાણા ભાષામહે | 5 વયં કદાપિ સ્તુતિવાદિનો

नाभवामेति यूयं ज्ञानीथ कदापि छलवस्त्रेण लोभं नाच्छाद्यामेत्यस्मिन्
 एश्वरः साक्षी विधते। 6 वयं श्रीष्टस्य प्रेरिता एव गौरवान्विता भवितुम्
 अशक्याम किन्तु युष्मत्तः परस्माद् वा कस्मादपि मानवाद् गौरवं न
 लिप्समाना युष्मन्मध्ये भूद्भवावा भूत्वावर्तामहि। 7 यथा कायिन्माता
 स्वकीयशिशून् पालयति तथा वयमपि युष्मान् काङ्क्षमाणा 8 युष्मत्तं
 केवलम् एश्वरस्य सुसंवाहं तन्नहि किन्तु स्वकीयप्राणान् अपि दातुं
 मनोभिरभ्यलषाम, यतो यूयम् अस्माकं स्नेहपात्रायभवत। 9 हे
 भ्रातरः, अस्माकं श्रमः क्लेशश्च युष्माभिः स्मर्यते युष्माकं कोऽपि
 यद् भारग्रस्तो न भवेत् तदर्थं वयं दिवानिशं परिश्राम्यन्तो युष्मन्मध्ये
 एश्वरस्य सुसंवाहमघोषयाम। 10 अपरञ्च विश्वासिनो युष्मान् प्रति
 वयं कीदृक् पवित्रत्वयथार्थत्वनिर्दोषत्वाचारिणोऽभवामेत्यस्मिन् एश्वरो
 यूयञ्च साक्षिण आध्वे। 11 अपरञ्च यद्दत् पिता स्वभालकान् तद्दद् वयं
 युष्माकम् अकेकं जनम् उपदिष्टवन्तः सान्त्वितवन्तश्च, 12 य एश्वरः
 स्वीयराज्याय विभवाय य युष्मान् आहूतवान् तदुपयुक्तायराणाय युष्मान्
 प्रवर्तितवन्तश्चेति यूयं ज्ञानीथ। 13 यस्मिन् समये यूयम् अस्माकं मुभाद्
 एश्वरेण प्रतिश्रुतं वाक्यम् अलभध्वं तस्मिन् समये तत् मानुषाणां वाक्यं
 न भव्त्वेश्वरस्य वाक्यं भत्वा गृहीतवन्त एति कारणाद् वयं निरन्तरम्
 एश्वरं धन्यं वदामः, यतस्तद् एश्वरस्य वाक्यम् एति सत्यं विश्वासिनां
 युष्माकं मध्ये तस्य गुणः प्रकाशते य। 14 हे भ्रातरः, श्रीष्टाश्रितवत्य
 एश्वरस्य याः समित्यो यिद्धादेशे सन्ति यूयं तासाम् अनुकारिणोऽभवत,
 तद्भुक्ता लोकाश्च यद्दद् यिद्धिलोकेभ्यस्तद्दद् यूयमपि स्वजातीयलोकेभ्यो
 दुःखम् अलभध्वं। 15 ते यिद्धीयाः प्रभुं यीशुं भविष्यद्वादिनश्च हतवन्तो
 ऽस्मान् दूरीकृतवन्तश्च, त एश्वराय न रोयन्ते सर्वेषां मानवानां विपक्षा
 भवन्ति यः 16 अपरं भिन्नजातीयलोकानां परित्राणार्थं तेषां मध्ये
 सुसंवाहमघोषणाद् अस्मान् प्रतिषेधन्ति येत्थं स्वीयपापानां परिमाणम्
 उत्तरोत्तरं पूरयन्ति, किन्तु तेषाम् अन्तकारी क्रोधस्तान् उपक्रमते। 17 हे
 भ्रातरः मनसा नहि किन्तु वदनेन कियत्कालं युष्मत्तो ऽस्माकं विच्छेदे जाते
 वयं युष्माकं मुभानि द्रष्टुम् अत्याकाङ्क्षया बहु यतितवन्तः। 18 द्विरेककृत्यो
 वा युष्मत्समीपगमनायास्माकं विशेषतः पौलस्य ममाभिलाषोऽभवत् किन्तु

शयतानो ऽस्मान् निवारितवान्। 19 यतोऽस्माकं का प्रत्याशा को वानन्दः किं वा श्लाघ्यकिरीटं? अस्माकं प्रभो र्थीशुश्रीष्टस्यागमनकाले तत्सम्भ्रमस्था यूयं किं तन्न भविष्यथ? 20 यूयम् अवास्माकं गौरवानन्दस्वः प्रपन्नो भवथ।

3 अतोऽदं यदा सन्देहं पुनः सोढुं नाशङ्कुवं तदानीम् आथीनीनगर अेकाडी स्थातुं निश्चित्य 2 स्वभ्रातरं श्रीष्टस्य सुसंवादे सलकारिणश्चेश्वरस्य परियारकं तीमथियं युष्मत्समीपम् अप्रेषयं। 3 वर्तमानैः क्लेशैः कस्यापि याञ्चल्यं यथा न जायते तथा ते त्वया स्थिरीक्रियन्तां स्वकीयधर्ममधि समाशवास्यन्ताञ्चेति तम् आदिशं। 4 वयमेतादृशे क्लेशे नियुक्ता आस्मल्ल एति यूयं स्वयं जानीथ, यतोऽस्माकं दुर्गतिं भविष्यतीति वयं युष्माकं समीपे स्थितिकालेऽपि युष्मान् अबोधयाम, तादृशमेव याभवत् तदपि जानीथ। 5 तस्मात् परीक्षकेण युष्मासु परीक्षितेष्वस्माकं परिश्रमो विद्मलो भविष्यतीति भयं सोढुं यदादं नाशङ्कुवं तदा युष्माकं विश्वासस्य तत्त्वावधारणाय तम् अप्रेषयं। 6 किन्त्वधुना तीमथियो युष्मत्समीपाद् अस्मत्सन्निधिम् आगत्य युष्माकं विश्वासप्रेमाणी अध्यस्मान् सुवार्तां ज्ञापितवान् वयञ्च यथा युष्मान् स्मरामस्तथा यूयमध्यस्मान् सर्व्वदा प्राणयेन स्मरथ द्रष्टुम् आकाङ्क्षध्वे येति कथितवान्। 7 हे भ्रातरः, वार्तामिमां प्राप्य युष्मानधि विशेषतो युष्माकं क्लेशदुःखान्यधि युष्माकं विश्वासाद् अस्माकं सान्त्वनाजायत; 8 यतो यूयं यद्दि प्रभाववतिष्ठथ तर्हानेन वयम् अधुना ज्ञवामः। 9 वयञ्चास्मदीयेश्वरस्य साक्षाद् युष्मत्तो जातेन येनानन्देन प्रकुल्ला भवामस्तस्य कृत्स्नस्यानन्दस्य योग्यरूपेणेश्वरं धन्यं वदितुं कथं शक्यामः? 10 वयं येन युष्माकं वदनानि द्रष्टुं युष्माकं विश्वासे यद् असिद्धं विधते तत् सिद्धीकर्तुञ्च शक्यामस्तादृशं वरं दिवानिशं प्रार्थयामहे। 11 अस्माकं तातेनेश्वरेण प्रभुना र्थीशुश्रीष्टेन य युष्मत्समीपगमनायास्माकं पन्था सुगमः क्रियतां। 12 परस्परं सर्व्वान् प्रति युष्माकं प्रेम युष्मान् प्रति यास्माकं प्रेम प्रभुना वर्द्धयतां बहुकुलं क्रियताञ्च। 13 अपरमस्माकं प्रभु र्थीशुश्रीष्टः स्वकीयैः सर्व्वैः पवित्रलोकैः साद्धं यदागमिष्यति तदा यूयं यथास्माकं तातस्येश्वरस्य सम्भ्रुषे पवित्रतया निर्दोषा भविष्यथ तथा युष्माकं मनांसि स्थिरीक्रियन्तां।

4 હે ભ્રાતરઃ, યુષ્માભિઃ કીદૃગ્ આચરિતવ્યં ઇશ્વરાચ રોચિતવ્યઞ્ચ તદધ્યસ્મત્તો યા શિક્ષા લબ્ધા તદનુસારાત્ પુનરતિશયં યત્નઃ ક્રિયતામિતિ વયં પ્રભુચીશુના યુષ્માન્ વિનીયાદિશામઃ | 2 યતો વયં પ્રભુચીશુના કીદૃશીરાજ્ઞા યુષ્માસુ સમર્પિતવન્તસ્તદ્ યૂયં જાનીથ | 3 ઇશ્વરસ્થાયમ્ અભિલાષો યદ્ યુષ્માકં પવિત્રતા ભવેત્, યૂયં વ્યભિચારાદ્ દૂરે તિષ્ઠત | 4 યુષ્માકમ્ એકૈકો જનઃ સ્વકીયં પ્રાણાધારં પવિત્રં માન્યઞ્ચ રક્ષતુ, 5 યે ય ભિન્નજાતીયા લોકા ઇશ્વરં ન જાનન્તિ ત ઇવ તત્ કામાભિલાષસ્થાધીનં ન કરોતુ | 6 એતસ્મિન્ વિષયે કોડપ્યત્યાચારી ભૂત્વા સ્વભ્રાતરં ન વઞ્ચયતુ યતોડસ્માભિઃ પૂર્વં યથોક્તં પ્રમાણીકૃતઞ્ચ તથૈવ પ્રભુરેતાદૃશાનાં કર્મણાં સમુચિતં ફલં દાસ્યતિ | 7 યસ્માદ્ ઇશ્વરોડસ્માન્ અશુચિતાયૈ નાહૂતવાન્ કિન્તુ પવિત્રત્વાયૈવાહૂતવાન્ | 8 અતો હેતો ર્યઃ કશ્ચિદ્ વાક્યમેતન્ન ગૃહ્ણાતિ સ મનુષ્યમ્ અવજાનાતીતિ નહિ યેન સ્વકીયાત્મા યુષ્મદન્તરે સમર્પિતસ્તમ્ ઇશ્વરમ્ એવાવજાનાતિ | 9 ભ્રાતૃષુ પ્રેમકરણમધિ યુષ્માન્ પ્રતિ મમ લિખનં નિષ્પ્રયોજનં યતો યૂયં પરસ્પરં પ્રેમકરણાયેશ્વરશિક્ષિતા લોકા આધ્યે | 10 કૃત્સ્ને માકિદનિયાદેશે ય યાવન્તો ભ્રાતરઃ સન્તિ તાન્ સર્વાન્ પ્રતિ યુષ્માભિસ્તત્ પ્રેમ પ્રકાશ્યતે તથાપિ હે ભ્રાતરઃ, વયં યુષ્માન્ વિનયામહે યૂયં પુન ઈહુતરં પ્રેમ પ્રકાશયત | 11 અપરં યે બહિઃસ્થિતાસ્તેષાં દૃષ્ટિગોચરે યુષ્માકમ્ આચરણં યત્ મનોરમ્યં ભવેત્ કસ્યાપિ વસ્તુનશ્ચાભાવો યુષ્માકં યન્ન ભવેત્, 12 એતદર્થ યૂયમ્ અસ્મત્તો યાદૃશામ્ આદેશં પ્રાપ્તવન્તસ્તાદૃશં નિર્વિરોધાચારં કર્તુ સ્વસ્વકર્મ્મણિ મનાંમિ નિધાતું નિજકરૈશ્ચ કાર્ય સાધયિતું યતદ્યં | 13 હે ભ્રાતરઃ નિરાશા અન્યે લોકા ઇવ યૂયં યન્ન શોચેદ્યં તદર્થ મહાનિદ્રાગતાન્ લોકાનધિ યુષ્માકમ્ અજ્ઞાનતા મયા નાભિલપ્યતે | 14 ચીશુ ભૂતવાન્ પુનરુચિતવાંશ્ચેતિ યદિ વયં વિશ્વાસમસ્તર્હિ ચીશુમ્ આશ્રિતાન્ મહાનિદ્રાપ્રાપ્તાન્ લોકાનપીશ્વરોડવશ્યં તેન સાર્દ્ધમ્ આનેષ્યતિ | 15 યતોડહં પ્રભો વાક્યેન યુષ્માન્ ઇદં જ્ઞાપયામિ; અસ્માકં મધ્યે યે જનાઃ પ્રભોરાગમનં યાવત્ જીવન્તોડવશેક્ષ્યન્તે તે મહાનિદ્રિતાનામ્ અગ્રગામિનોન ન ભવિષ્યન્તિ; 16 યતઃ પ્રભુઃ સિંહનાદેન પ્રધાનસ્વર્ગદ્દૂતસ્યોચ્ચૈઃ શબ્દેનેશ્વરીયતૂરીવાધેન ય સ્વયં સ્વર્ગાદ્ અવરોક્ષ્યતિ તેન પ્રીષ્ટાશ્રિતા મૃતલોકાઃ પ્રથમમ્ ઉત્થાસ્યાન્તિ | 17 અપરમ્ અસ્માકં મધ્યે યે જીવન્તોડવશેક્ષ્યન્તે ત આકાશે પ્રભોઃ

साक्षात्करणार्थं तैः सार्द्धं भेद्यवाङ्मनेन हरिष्यन्ते; एतद्यत्र वयं सर्व्वदा प्रभुना
सार्द्धं स्थास्यामः | 18 अतो यूयम् अतोभिः कथाभिः परस्परं सान्त्वयत |

5 हे आतरः, कालान् समयांश्चाधि युष्मान् प्रति मम लिप्पनं निष्प्रयोजनं,
2 यतो रात्रौ यादृक् तस्करस्तादृक् प्रभो र्दिनम् उपस्थास्यतीति यूयं स्वयमेव
सभ्यग् जानीथ | 3 शान्तिं निर्व्विन्धत्वञ्च विधत् एति यदा मानवा
वद्विष्यन्ति तदा प्रसववेदना यद्वद् गर्भिर्नमीम् उपतिष्ठति तद्वद् अकस्माद्
विनाशस्तान् उपस्थास्यति तैरुद्धारो न लप्स्यते | 4 किन्तु हे आतरः,
यूयम् अन्धकारेणावृता न भवथ तस्मात् तद्दिनं तस्कर एव युष्मान् न
प्राप्स्यति | 5 सर्व्वे यूयं दीप्तेः सन्ताना दिवायाश्च सन्ताना भवथ वयं
निशावंशास्तिमिरवंशा वा न भवामः | 6 अतो ऽपरे यथा निद्रागताः सन्ति
तद्वद् अस्माभिर्न भवितव्यं किन्तु जागरितव्यं सयेतनैश्च भवितव्यं |
7 ये निद्रान्ति ते निशायामेव निद्रान्ति ते य मत्ता भवन्ति ते रञ्ज्यामेव
मत्ता भवन्ति | 8 किन्तु वयं दिवसस्य वंशा भवामः; अतो ऽस्माभि
र्वक्षसि प्रत्ययप्रेमरूपं क्वयं शिरसि य परित्राणशाशरूपं शिरस्त्रं परिधाय
सयेतनैर्भवितव्यं | 9 यत एश्वरोऽस्मान् क्रोधे न नियुज्यास्माकं प्रभुना
यीशुप्रीष्टेन परित्राणस्याधिकारे नियुक्तवान्, 10 जाग्रतो निद्रागता वा वयं
यत् तेन प्रभुना सङ्गो वा मस्तदर्थं सोऽस्माकं कृते प्राणान् त्यक्तवान् | 11
अतमेव यूयं यद्वत् कुरुथ तद्वत् परस्परं सान्त्वयत सुस्थिरीकुरुध्वञ्च | 12
हे आतरः, युष्माकं मध्ये ये जनाः परिश्रमं कुर्व्वन्ति प्रभो नान्मा युष्मान्
अधितिष्ठन्त्युपदिशन्ति य तान् यूयं सम्मन्यध्वं | 13 स्वकर्म्महेतुना य प्रेम्ना
तान् अतीवादृयध्वमिति मम प्रार्थना, यूयं परस्परं निर्व्विरोधा भवत | 14
हे आतरः, युष्मान् विनयामहे यूयम् अविडिताचारिणो लोकान् भर्त्सयध्वं,
क्षुद्रमनसः सान्त्वयत, दुर्बलान् उपकुरुत, सर्व्वान् प्रति सदिष्णवो भवत
य | 15 अपरं क्वमपि प्रत्यनिष्टस्य कुलम् अनिष्टं केनापि यन्न क्रियेत तदर्थं
सावधाना भवत, किन्तु परस्परं सर्व्वान् मानवांश्च प्रति नित्यं विताचारिणो
भवत | 16 सर्व्वदानन्दत | 17 निरन्तरं प्रार्थनां कुरुध्वं | 18 सर्व्वविषये
कृतज्ञतां स्वीकुरुध्वं यत अेतदेव प्रीष्टयीशुना युष्मान् प्रति प्रकाशितम्
एश्वराभिमतं | 19 पवित्रम् आत्मानं न निर्व्वापयत | 20 एश्वरीयादेशं
नावजानीत | 21 सर्व्वानि परीक्ष्य यद् भद्रं तदेव धारयत | 22 यत् किमपि

पाप३पं भवति तस्माद् दूरं तिष्ठत। 23 शान्तिदायक ईश्वरः स्वयं युष्मान्
सम्पूर्णत्वेन पवित्रान् करोतु, अपरम् अस्मत्प्रभो र्थीशुभ्रीष्टस्यागमनं यावद्
युष्माकम् आत्मानः प्राणाः शरीराणि य निषिलानि निर्दोषत्वेन रक्षयन्तां।
24 यो युष्मान् आह्वयति स विश्वसनीयोऽतः स तत् साधयिष्यति। 25 डे
ब्रातरः, अस्माकं कृते प्रार्थनां कुरुध्वं। 26 पवित्रयुम्बनेन सर्वान् ब्रातृन्
प्रति सत्कुरुध्वं। 27 पत्रमिदं सर्वेषां पवित्राणां ब्रातृणां श्रुतिगोचरे
युष्माभिः पठ्यतामिति प्रभो नमिन्ना युष्मान् शपयामि। 28 अस्माकं प्रभो
र्थीशुभ्रीष्टस्यानुग्रहे युष्मासु भूयात्। आमेन्।

२ थिषलनीकिनः

1 पौलः सिल्वानस्तीमथियश्चेतिनामानो वयम् अस्मदीयतातम् एश्वरं प्रभुं यीशुप्रीष्टआश्रितां थिषलनीकिनां समितिं प्रति पत्रं लिखामः | 2 अस्माकं तात एश्वरः प्रभु र्थीशुप्रीष्टश्च युष्मास्वनुग्रहं शान्तिञ्च क्रियास्तां | 3 हे भ्रातरः, युष्माकं कृते सर्व्वदा यथायोग्यम् एश्वरस्य धन्यवादो ऽस्माभिः कर्त्तव्यः, यतो हेतो र्थुष्माकं विश्वास उत्तरोत्तरं वर्द्धते परस्परम् अकैकस्य प्रेम य बहुङ्गलं भवति | 4 तस्माद् युष्माभि र्थावन्त उपद्रवकलेशाः सहान्ते तेषु यद् धैर्य्यं यश्च विश्वासः प्रकाश्यते तत्कारणाद् वयम् एश्वरीयसमितिषु युष्माभिः श्लाघामहे | 5 तस्येश्वरस्य न्यायवियारस्य प्रमाणां भवति यतो यूयं यस्य कृते दुःखं सङ्घ्वं तस्येश्वरीयराज्यस्य योग्या भवथ | 6 यतः स्वकीयस्वर्गदूतानां बलैः सखितस्य प्रभो र्थीशोः स्वर्गाद् आगमनकाले युष्माकं क्लेशकेत्यः क्लेशेन इलदानं सार्द्धमस्माभिश्च 7 क्लिश्यमानेभ्यो युष्मत्स्यं शान्तिदानम् एश्वरेण न्याय्यं भोक्तव्यं; 8 तदानीम् एश्वरानभिज्ञेभ्यो ऽस्मत्प्रभो र्थीशुप्रीष्टस्य सुसंवादाग्राहकेभ्यश्च लोकेभ्यो जाज्वल्यमानेन वह्निना समुचितं इलं यीशुना दास्यते; 9 ते य प्रभो र्वदनात् पराक्रमयुक्तविभववाच्य सदातनविनाशरूपं दण्डं लप्स्यन्ते, (aiōnios g166) 10 किन्तु तस्मिन् दिने स्वकीयपवित्रलोकेषु विराजितुं युष्मान् अपरांश्च सर्व्वान् विश्वासिलोडान् विस्मापयितुञ्च स आगमिष्यति यतो ऽस्माकं प्रमाणे युष्माभि विश्वासोऽकारि | 11 अतोऽस्माकम् एश्वरो युष्मान् तस्याह्वानस्य योग्यान् करोतु सौजन्यस्य शुभइलं विश्वासस्य गुणञ्च पराक्रमेण साधयत्विति प्रार्थनास्माभिः सर्व्वदा युष्मन्निमित्तं क्रियते, 12 यतस्तथा सत्यस्माकम् एश्वरस्य प्रभो र्थीशुप्रीष्टस्य यानुग्रहाद् अस्मत्प्रभो र्थीशुप्रीष्टस्य नाम्नो गौरवं युष्मासु युष्माकमपि गौरवं तस्मिन् प्रकाशिष्यते |

2 हे भ्रातरः, अस्माकं प्रभो र्थीशुप्रीष्टस्यागमनं तस्य समीपे ऽस्माकं संस्थितिञ्चाधि वयं युष्मान् एदं प्रार्थयामहे, 2 प्रभेस्तद् दिनं प्रायेणोपस्थितम् एति यदि कश्चिद् आत्मना वाया वा पत्रेण वास्माकम् आदेशं कल्पयन् युष्मान् गदति तर्हि यूयं तेन यत्रलभनस उद्विग्नाश्च न भवत | 3 केनापि प्रकारेण कोऽपि युष्मान् न वञ्चयतु यतस्तस्माद् दिनात् पूर्वं धर्मलोपेनोपस्थातव्यं,

4 यश्च जनो विपक्षतां कुर्वन् सर्वस्माद् देवात् पूजनीयवस्तुश्रोन्नंस्यते स्वम् ईश्वरमिव दर्शयन् ईश्वरवद् ईश्वरस्य मन्दिर उपवेक्ष्यति य तेन विनाशपात्रेण पापपुरुषेणोद्देतव्यं। 5 यदाहं युष्माकं सन्निधावासं तदानीम् अेतद् अकथयमिति यूयं किं न स्मरथ? 6 साम्प्रतं स येन निवार्यते तद् यूयं जानीथ, किन्तु स्वसमये तेनोद्देतव्यं। 7 विधर्म्मस्य निगूढो गुण एवमिदानीमपि इलति किन्तु यस्तं निवारयति सोऽधापि दूरीकृतो नाभवत्। 8 तस्मिन् दूरीकृते स विधर्म्युद्देष्ट्यति किन्तु प्रभु र्यीशुः स्वमुष्पवनेन तं विध्वंसयिष्यति निजोपस्थितेस्तेजसा विनाशयिष्यति य। 9 शयतानस्य शक्तिप्रकाशनाद् विनाश्यमानानां मध्ये सर्वविधाः पराक्रमा भ्रमिका आश्चर्यक्रिया लक्षणाऽन्यधर्मजाता सर्वविधप्रतारणा य तस्योपस्थितेः इदं भविष्यति; 10 यतो देतोस्ते परित्राणप्राप्तये सत्यधर्मस्यानुरागं न गृहीतवन्तस्तस्मात् कारणाद् 11 ईश्वरेण तान् प्रति भ्रान्तिकरमायायां प्रेषितायां ते मृषावाक्ये विश्वसिष्यन्ति। 12 यतो यावन्तो मानवाः सत्यधर्मे न विश्वस्याधर्मोण तुष्यन्ति तैः सर्वे ईएऽत्माजनैर्भवितव्यं। 13 हे प्रभोः प्रिया भ्रातरः, युष्माकं कृत ईश्वरस्य धन्यवाहोऽस्माभिः सर्वदा कर्तव्यो यत ईश्वर आ प्रथमाद् आत्मनः पावनेन सत्यधर्मे विश्वासेन य परित्राणार्थं युष्मान् वरीतवान् 14 तर्थास्माभिर्घोषितेन सुसंवादेन युष्मान् आहूयास्माकं प्रभो र्यीशुः प्रीष्टस्य तेजसोऽधिकारिणः करिष्यति। 15 अतो हे भ्रातरः यूयम् अस्माकं वाक्यैः पत्रैश्च यां शिक्षां लब्धवन्तस्तां कृत्स्नां शिक्षां धारयन्तः सुस्थिरा भवत। 16 अस्माकं प्रभु र्यीशुः प्रीष्टतात ईश्वरश्चार्थतो यो युष्मासु प्रेम कृतवान् नित्याञ्च सान्त्वनाम् अनुग्रहेणोत्तमप्रत्याशाञ्च युष्मभ्यं दत्तवान् (aiōnios g166) 17 स स्वयं युष्माकम् अन्तःकराणानि सान्त्वयतु सर्वस्मिन् सद्वाक्ये सत्कर्म्मणि य सुस्थिरीकरोतु य।

3 हे भ्रातरः, शेषे वदामि, यूयम् अस्मभ्यमिदं प्रार्थयध्वं यत् प्रभो वाक्यं युष्माकं मध्ये यथा तथैवान्यत्रापि प्रयरेत् मान्यञ्च भवेत्; 2 यद्य वयम् अविवेककेभ्यो दृष्टेभ्यश्च लोकेभ्यो रक्षां प्राप्नुयाम यतः सर्वेषां विश्वासो न भवति। 3 किन्तु प्रभु विश्वास्यः स अेव युष्मान् स्थिरीकरिष्यति दृष्टस्य कराद् उद्दरिष्यति य। 4 यूयम् अस्माभि र्यद् आदिश्यध्वे तत् कुरुथ

करिष्यथ येति विश्वासो युष्मानधि प्रभुनास्माकं जायते। 5 एश्वरस्य
 प्रेम्नि श्रीष्टस्य सखिष्णुतायाञ्च प्रभुः स्वयं युष्माकम् अन्तःकरणानि
 विनयतु। 6 हे भ्रातरः, अस्मत्प्रभो रीशुश्रीष्टस्य नाम्ना वयं युष्मान्
 एदम् आदिशामः, अस्मत्तो युष्माभि र्या शिक्षलम्भि तां विडाय कश्चिद्
 भ्राता यधविडितायारं करोति तर्हि यूयं तस्मात् पृथग् भवत। 7 यतो
 वयं युष्माभिः कथम् अनुकर्त्तव्यास्तद् यूयं स्वयं जानीथ। युष्माकं मध्ये
 वयम् अविडितायारिणो नाभवाम, 8 विनामूल्यं कस्याप्यन्नं नाभुञ्जमहि
 किन्तु कोऽपि यद् अस्माभि र्भारग्रस्तो न भवेत् तदर्थं भ्रमेण क्लेशेन य
 द्विवानिशं कार्यम् अकुर्म। 9 अत्रास्माकम् अधिकारो नास्तीत्यं नहि
 किन्त्वस्माकम् अनुकरणाय युष्मान् दृष्टान्तं दर्शयितुम् एच्छन्तस्तद् अकुर्म।
 10 यतो येन कार्यं न क्रियते तेनाडारोऽपि न क्रियतामिति वयं युष्मत्समीप
 उपस्थितिकालेऽपि युष्मान् आदिशाम। 11 युष्मन्मध्ये ऽविडितायारिणः
 केऽपि जना विधन्ते ते य कार्यम् अकुर्वन्त आलस्यम् आयरन्तीत्यस्माभिः
 श्रूयते। 12 तादृशान् लोकान् अस्मत्प्रभो रीशुश्रीष्टस्य नाम्ना वयम् एदम्
 आदिशाम आज्ञापयामश्च, ते शान्तभावेन कार्यं कुर्वन्तः स्वकीयमन्नं
 भुञ्जतां। 13 अपरं हे भ्रातरः, यूयं सदायरणो न क्लाम्यत। 14 यद्वि य
 कश्चिदेतत्पत्रे लिपिताम् अस्माकम् आज्ञां न गृह्णाति तर्हि यूयं तं मानुषं
 लक्षयत तस्य संसर्गं त्यजत य तेन स त्रपिष्यते। 15 किन्तु तं न शत्रुं
 मन्यमाना भ्रातरमिव येतयत। 16 शान्तिदाता प्रभुः सर्वत्र सर्वथा
 युष्मत्स्यं शान्तिं देयात्। प्रभु युष्माकं सर्वेषां सङ्गी भूयात्। 17 नभस्कार
 ओष पौलस्य मम करेण लिपितोऽभूत् सर्वस्मिन् पत्र अतन्मम चिह्नम्
 अेतादृशैरक्षरै र्भया लिप्यते। 18 अस्माकं प्रभो रीशुश्रीष्टस्यानुग्रहः
 सर्वेषु युष्मासु भूयात्। आमेन्।

१ तीमथियः

1 अस्माकं त्राणकर्तुरीश्वरस्यास्माकं प्रत्याशात्मभूः प्रभो यीशुः प्रीतिः स्यात्
याज्ञानुसारतो यीशुः प्रीतिः प्रेरितः पौलः स्वकीयं सत्यं धर्मपुत्रं तीमथियं
प्रति पत्रं लिखति | 2 अस्माकं तात ईश्वरोऽस्माकं प्रभु यीशुः प्रीतिः त्वयि
अनुग्रहं द्यां शान्तिं कुर्व्यास्तां | 3 माकिदनियादेशे मम गमनकाले त्वम्
ईडिफनगरे तिष्ठन् ईतरशिक्षा न ग्रहीतव्या, अनन्तेषूप्राप्त्यानेषु वंशावलिषु
य युष्माभिर्मनो न निवेशितव्यम् | 4 एति कांश्चित् लोकान् यद् उपदेशेरेतत्
मयादिष्टोऽभवः, यतः सर्वैरेतैर्विश्वासयुक्तेष्वरीयनिष्ठा न जायते किन्तु
विवाहो जायते | 5 उपदेशस्य त्वमिप्रेतं इत्वं निर्मलान्तःकरणेन सत्संवेदेन
निष्कपटविश्वासेन य युक्तं प्रेम | 6 केचित् जनाश्च सर्वाण्येतानि विहाय
निरर्थककथानाम् अनुगमनेन विपथगामिनोऽभवन्, 7 यद् भाषन्ते यस्य
निश्चिन्वन्ति तन्न बुध्यमाना व्यवस्थोपदेशारो भवितुम् ईच्छन्ति | 8 सा
व्यवस्था यद्दियोग्यज्ञोऽपि गृह्यते तर्ह्युत्तमा भवतीति वयं जानीमः | 9
अपरं सा व्यवस्था धार्मिकस्य विरुद्धा न भवति किन्त्वधार्मिकोऽवाध्यो
दुष्टः पापिष्ठोऽपवित्रोऽशुचिः पितृहन्ता मातृहन्ता नरहन्ता 10 वेश्यागामी
पुंमैथुनी मनुष्यविक्रेता मिथ्यावादी मिथ्याशपथकारी य सर्वेषामेतेषां
विरुद्धा, 11 तथा सख्येदानन्देश्वरस्य यो विभवयुक्तः सुसंवादी मयि
समर्पितस्तदनुयायिहितोपदेशस्य विपरीतं यत् किञ्चिद् भवति तद्विरुद्धा
सा व्यवस्थेति तद्ग्राहिणा ज्ञातव्यं | 12 मह्यं शक्तिदाता योऽस्माकं
प्रभुः प्रीतिः यीशुस्तमदं धन्यं वदामि | 13 यतः पुरा निन्दक उपद्रावी
हिंसकश्च भूत्वाप्यहं तेन विश्वास्योऽमन्ये परियारकत्वे न्ययुज्ये य | तद्
अविश्वासायराणाम् अज्ञानेन मया कृतमिति हेतोरहं तेनानुकम्पितोऽभवम् |
14 अपरं प्रीतिः यीशो विश्वासप्रेमभ्यां सङ्घितोऽस्मत्प्रभोरनुग्रहोऽतीव
प्रयुरोऽभवत् | 15 पापिनः परित्रातुं प्रीतिः यीशुः ईगतिः समवतीर्णोऽभवत्,
अेषा कथा विश्वासनीया सर्वेऽग्रहणीया य | 16 तेषां पापिनां मध्येऽहं
प्रथम आसं किन्तु ये मानवा अनन्तजिवनप्राप्त्यर्थं तस्मिन् विश्वसिष्यन्ति
तेषां दृष्टान्ते मयि प्रथमे यीशुना प्रीतिः स्वकीया कृत्स्ना यिरसङ्घिष्णुता
यत् प्रकाश्यते तदर्थमेवाहम् अनुकम्पां प्राप्तवान् | (aiōnios g166) 17
अनादिरक्षयोऽदृश्यो राजा योऽद्वितीयः सर्वज्ञ ईश्वरस्तस्य गौरवं महिमा

यानन्तकालं यावद् भूयात् | आभेन् | (aiōn g165) 18 हे पुत्र तीमथिय त्वयि
यानि भविष्यद्वाक्यानि पुरा कथितानि तदनुसाराद् अहम् अनेमादेशं त्वयि
समर्पयामि, तस्याभिप्रायोऽयं यत्त्वं तैर्वाक्यैरुत्तमयुद्धं करोषि 19 विश्वासं
सत्संवेदञ्च धारयसि य | अनयोः परित्यागात् केषाञ्चिद् विश्वासतरी
भग्नाभवत् | 20 डुमिनायसिकन्दरौ तेषां यौ द्वौ जनौ, तौ यद् धर्मनिन्दां
पुनर्न कर्तुं शिक्षेते तदर्थं मया शयतानस्य करे समर्पितौ |

2 मम प्रथम आदेशोऽयं, प्रार्थनाविनयनिवेदनधन्यवादाः कर्तव्याः, 2 सर्वेषां
मानवानां कृते विशेषतो वयं यत् शान्तत्वेन निर्विरोधत्वेन येश्वरभक्तिं
विनीतत्वआयन्तः कालं यापयामस्तदर्थं नृपतीनाम् उच्यपदस्थानाञ्च कृते
ते कर्तव्याः | 3 यतोऽस्माकं तारकस्येश्वरस्य साक्षात् तदेवोत्तमं ग्राह्यञ्च
भवति, 4 स सर्वेषां मानवानां परित्राणं सत्यज्ञानप्राप्तिञ्चेच्छति | 5 यत
अकोऽद्वितीय ईश्वरो विधते किञ्चेश्वरे मानवेषु यैकोऽद्वितीयो मध्यस्थः 6 स
नरावतारः श्रीष्टो यीशु विधते यः सर्वेषां मुक्ते भूव्यम् आत्मदानं कृतवान् |
अतेन येन प्रमाणेनोपयुक्ते समये प्रकाशितव्यं, 7 तद्दोषयिता दूतो विश्वासे
सत्यधर्मे यं भिन्नजातीयानाम् उपदेशकश्चाहं न्ययूज्ये, अतएवं श्रीष्टस्य
नाम्ना यथातथ्यं वदामि नानृतं कथयामि | 8 अतो ममाभिमतमिदं पुरुषैः
कोधसन्देहौ विना पवित्रकरान् उत्तोल्य सर्वस्मिन् स्थाने प्रार्थना क्रियतां | 9
तद्वत् नाय्योऽपि सलज्जाः संयतमनसश्च सत्यो योग्यमाच्छादनं परिदधतु
किञ्च केशसंस्कारैः काण्डमुक्ताभिर्महाधर्मपरिच्छदैश्चात्मभूषणं न कुर्वत्यः
10 स्वीकृतेश्वरभक्तीनां योषितां योग्यैः सत्यधर्माभिः स्वभूषणं कुर्वतां |
11 नारी सम्पूर्णविनीतत्वेन निर्विरोधं शिक्षतां | 12 नाय्याः शिक्षादानं
पुरुषायाज्ञादानं वाहं नानुजानामि तथा निर्विरोधत्वम् आचरितव्यं |
13 यतः प्रथमम् आहमस्ततः परं उवाचाः सृष्टिर्भवत् | 14 किञ्चाहम्
भ्रान्तियुक्तो नाभवत् योषिदेव भ्रान्तियुक्ता भूत्वात्याचारिणी भवत् | 15
तथापि नारीगणो यदि विश्वासे प्रेम्नि पवित्रतायां संयतमनसि यं तिष्ठति
तर्ह्यपत्यप्रसववर्त्मना परित्राणं प्राप्स्यति |

3 यदि कश्चिद् अध्यक्षपदम् आकाङ्क्षते तर्हि स उत्तमं कर्म लिप्सत इति
सत्यं | 2 अतोऽध्यक्षोऽपानिन्दितेनैकस्या योषितो भर्त्रा परिमितभोगेन
संयतमनसा सत्येनातिथिसेवकेन शिक्षणं निपुणेन 3 न मधुपेन न प्रहारकेण

किन्तु मूढभावेन निर्व्विवादेन निर्लोभेन 4 स्वपरिवाराणाम् उत्तमशासकेन पूर्णविनीतत्वाद् वश्यानां सन्तानानां नियन्त्रा य भवितव्यं। 5 यत आत्मपरिवारान् शासितुं यो न शक्नोति तेनेश्वरस्य समितेस्तत्त्वावधारणं कथं कारिष्यते? 6 अपरं स गर्वितो भूत्वा यत् शयतानं एव दण्डयोग्यो न भवेत् तदर्थं तेन नवशिष्येण न भवितव्यं। 7 यय्य निन्द्यायां शयतानस्य जाले य न पतेत् तदर्थं तेन बहिःस्थलोकानामपि मध्ये सुभ्यातियुक्तेन भवितव्यं। 8 तद्वत् परियारकैरपि विनीतैर्द्विविधवाक्यरहितैर्बहुमधुपाने ऽनासक्तैर्निर्लोभैश्च भवितव्यं, 9 निर्भलसंवेदेन य विश्वासस्य निगूढवाक्यं धातव्यञ्च। 10 अत्रे तेषां परीक्षा क्रियतां ततः परम् अनिन्दिता भूत्वा ते परियय्यां कुर्वन्तु। 11 अपरं योषिद्विरपि विनीताभिरनपवादिकाभिः सतर्काभिः सर्वत्र विश्वास्याभिश्च भवितव्यं। 12 परियारका अकैकयोषितो भर्तारो भवेयुः, निजसन्तानानां परिजनानाञ्च सुशासनं कुर्युश्च। 13 यतः सा परियय्यां यैर्बद्धरूपेण साध्यते ते श्रेष्ठपदं प्राप्नुवन्ति प्रीष्टे यीशौ विश्वासेन महोत्सुका भवन्ति य। 14 त्वां प्रत्येतत्पत्रलोभनसमये शीघ्रं त्वत्समीपगमनस्य प्रत्याशा मम विधते। 15 यद्वि वा विलम्बेय तर्हीश्वरस्य गृहे ऽर्थतः सत्यधर्मस्य स्तम्भभित्तिमूलस्वरूपायाम् अमरेश्वरस्य समितौ त्वया कीदृश आचारः कर्तव्यस्तत् ज्ञातुं शक्यते। 16 अपरं यस्य महत्त्वं सर्वस्वीकृतम् एश्वरभक्तेस्तत् निगूढवाक्यमिदम् एश्वरो मानवदेहे प्रकाशित आत्मना सपुण्यीकृतो दूतैः सन्दृष्टः सर्वज्जातीयानां निकटे घोषितो जगतो विश्वासपात्रीभूतस्तेजःप्राप्तये स्वर्गं नीतश्चेति।

4 पवित्र आत्मा स्पष्टम् एदं वाक्यं वदति यरमकाले कतिपयलोका वह्निनाङ्कितत्वात् 2 कठोरमनसां कापट्याद् अनृतवादिनां विवाहनिषेधकानां भक्ष्यविशेषनिषेधकानाञ्च 3 भूतस्वरूपाणां शिक्षायां भ्रमकात्मनां वाक्येषु य मनांसि निवेश्य धर्माद् अंशिष्यन्ते। तानि तु भक्ष्याणि विश्वासिनां स्वीकृतसत्यधर्माणाञ्च धन्यवाहसहिताय भोगायेश्वरेण ससृष्टिरे। 4 यत एश्वरेण यधत् सृष्टं तत् सर्वम् उत्तमं यद्वि य धन्यवादेन भुज्यते तर्हि तस्य किमपि नाग्राह्यं भवति, 5 यत एश्वरस्य वाक्येन प्रार्थनया य तत् पवित्रीभवति। 6 अेतानि वाक्यानि यद्वि त्वं ब्रातृन् ज्ञापयेस्तर्हि यीशुप्रीष्टस्योत्तमः परियारको भविष्यसि यो

વિશ્વાસો હિતોપદેશશ્ચ ત્વયા ગૃહીતસ્તદીયવાક્યૈરાધ્યાયિષ્યસે ચ | 7
 યાન્યુપાખ્યાનાનિ દુર્ભાવાનિ વૃદ્ધયોષિતામેવ યોગ્યાનિ ચ તાનિ ત્વયા
 વિસૃજ્યન્તામ્ ઈશ્વરભક્તયે યત્નઃ ક્રિયતાન્ત્ર | 8 યતઃ શારીરિકો
 યત્નઃ સ્વલ્પફલદો ભવતિ કિન્ત્વીશ્વરભક્તિરૈહિકપારત્રિકજીવનયોઃ
 પ્રતિજ્ઞાયુક્તા સતી સર્વત્ર ફલદા ભવતિ | 9 વાક્યમેતદ્ વિશ્વસનીયં
 સર્વે ગ્રહણીયન્ત્ર વચન્ત્ર તદર્થમેવ શ્રામ્યામો નિન્દાં ભુંજમહે ચ | 10 યતો
 હેતોઃ સર્વમાનવાનાં વિશેષતો વિશ્વાસિનાં ત્રાતા યોડમર ઈશ્વરસ્તસ્મિન્
 વયં વિશ્વસામઃ | 11 ત્વમ્ એતાનિ વાક્યાનિ પ્રચારય સમુપદિશ ચ |
 12 અલ્પવચષ્ટવાત્ કેનાપ્યવજ્ઞેયો ન ભવ કિન્ત્વાલાપેનાચરણેન પ્રેમ્ના
 સદાત્મત્વેન વિશ્વાસેન શુચિત્વેન ચ વિશ્વાસિનામ્ આદર્શો ભવ | 13
 યાવન્નાહમ્ આગમિષ્યામિ તાવત્ ત્વ પાઠે ચેતયને ઉપદેશે ચ મનો
 નિઘત્સ્ય | 14 પ્રાચીનગણહસ્તાર્પણસહિતેન ભવિષ્યદ્વાક્યેન યદ્દાનં તુભ્યં
 વિશ્રાણિતં તવાન્તઃસ્થે તસ્મિન્ દાને શિથિલમના મા ભવ | 15 એતેષુ મનો
 નિવેશય, એતેષુ વર્તસ્વ, ઇત્યન્ત્ર સર્વવિષયે તવ ગુણવૃદ્ધિઃ પ્રકાશતાં | 16
 સ્વસ્મિન્ ઉપદેશે ચ સાવધાનો ભૂત્વાવતિષ્ઠસ્વ તત્ કૃત્વા ત્વયાત્મપરિત્રાણં
 શ્રોતૃણાન્ત્ર પરિત્રાણં સાધયિષ્યતે |

5 ત્વં પ્રાચીનં ન ભર્ત્સય કિન્તુ તં પિતરમિવ યૂનશ્ચ ભ્રાતૃનિવ 2 વૃદ્ધાઃ
 સ્ત્રિયશ્ચ માતૃનિવ યુવતીશ્ચ પૂર્ણશુચિત્વેન ભગિનીરિવ વિનયસ્વ | 3
 અપરં સત્યવિધવાઃ સમ્મન્યસ્વ | 4 કસ્યાશ્ચિદ્ વિધવાયા યદિ પુત્રાઃ પૌત્રા
 વા વિધન્તે તર્હિ તે પ્રથમતઃ સ્વીયપરિજનાન્ સેવિતું પિત્રોઃ પ્રત્યુપકર્તુન્ત્ર
 શિક્ષન્તાં યતસ્તદેવેશ્વરસ્ય સાક્ષાદ્ ઉત્તમં ગ્રાહ્યન્ત્ર કર્મ | 5 અપરં
 યા નારી સત્યવિધવા નાથહીના યાસ્તિ સા ઈશ્વરસ્યાશ્રયે તિષ્ઠન્તી
 દિવાનિશં નિવેદનપ્રાર્થનાભ્યાં કાલં યાપયતિ | 6 કિન્તુ યા વિધવા
 સુખભોગાસક્તા સા જીવત્યપિ મૃતા ભવતિ | 7 અતએવ તા યદ્
 અનિન્દિતા ભવેયૂસ્તદર્થમ્ એતાનિ ત્વયા નિદિશ્યન્તાં | 8 યદિ કશ્ચિત્
 સ્વજાતીયાન્ લોકાન્ વિશેષતઃ સ્વીયપરિજનાન્ ન પાલયતિ તર્હિ સ
 વિશ્વાસાદ્ ભ્રષ્ટો ડ્યધમશ્ચ ભવતિ | 9 વિધવાવર્ગે યસ્યા ગણના
 ભવતિ તયા ષષ્ટિવત્સરેભ્યો ન્યૂનવયસ્કયા ન ભવિતવ્યં; અપરં પૂર્વમ્
 એકસ્વામિકા ભૂત્વા 10 સા યત્ શિશુપોષણેનાતિથિસેવનેન પવિત્રલોકાનાં

यरणाप्रक्षालनेन क्लिष्टानाम् उपकारेण सर्वविधसत्कर्मयरणेन य
 सत्कर्मकरणात् सुभ्यातिप्राप्ता भवेत् तदध्यावश्यकं | 11 किन्तु युवती
 विधवा न गृह्णाण यतः प्रीष्टस्य वैपरीत्येन तासां दर्पे जाते ता विवाहम्
 धृच्छन्ति | 12 तस्माद्य पूर्वधर्मं परित्यज्य दण्डनीया भवन्ति | 13
 अनन्तरं ता गृह्णाद् गृहं पर्यटन्त्य आलस्यं शिक्षन्ते केवलमालस्यं नहि
 किन्तुनर्थकालापं पराधिकारयव्याञ्चापि शिक्षमाणा अनुयितानि वाक्यानि
 भाषन्ते | 14 अतो ममेच्छेयं युवत्यो विधवा विवाहं कुर्वताम् अपत्यवत्यो
 भवन्तु गृहकर्म कुर्वताञ्चेत्थं विपक्षाय किमपि निन्दाद्वारं न ददतु | 15
 यत एतः पूर्वम् अपि काञ्चित् शयतानस्य पश्चाद्गामिन्यो जाताः | 16
 अपरं विश्वासिन्या विश्वासिनो वा कस्यापि परिवाराणां मध्ये यद्वि
 विधवा विधन्ते तर्हि स ताः प्रतिपालयतु तस्मात् समितौ भारे जनारोपिते
 सत्यविधवानां प्रतिपालनं कर्तुं तथा शक्यते | 17 ये प्राञ्चः समितिं
 सभ्यगू अदितिष्ठन्ति विशेषत एश्वरवाक्येनोपदेशेन य ये यत्नं विदधते ते
 द्विगुणस्यादरस्य योग्या मान्यन्तां | 18 यस्मात् शास्त्रे लिखितमिदमास्ते,
 त्वं शस्यमर्दकवृषस्यास्यं मा बधानेति, अपरमपि कार्यकृद् वेतनस्य योग्यो
 भवतीति | 19 द्वौ त्रीन् वा साक्षिणो विना कस्यायित् प्राचीनस्य विरुद्धम्
 अभियोगस्त्वया न गृह्यतां | 20 अपरं ये पापमायरन्ति तान् सर्वेषां समक्षं
 भर्त्सयस्व तेनापरेषामपि भीतिं र्जनिष्यते | 21 अहम् एश्वरस्य प्रभो
 र्यीशुप्रीष्टस्य मनोनीतदिव्यदूतानाञ्च गोचरे त्वाम् एहम् आज्ञापयामि त्वं
 कस्याप्यनुरोधेन किमपि न कुर्वन् विनापक्षपातम् अेतान विधीन् पालय |
 22 कस्यापि मूर्द्ध्नि हस्तापाणौ त्वरया माकार्षीः | परपापानाञ्चांशी मा भव |
 स्वं शुचिं रक्ष | 23 अपरं तवोदरपीडायाः पुनः पुन दुर्बलतायाश्च निमित्तं
 केवलं तोयं न पिवन् किञ्चिन् मधं पिव | 24 केषाञ्चित् मानवानां पापानि
 विचारात् पूर्व्वं केषाञ्चित् पश्चात् प्रकाशन्ते | 25 तथैव सत्कर्मार्णयपि
 प्रकाशन्ते तदन्यथा सति प्रच्छन्नानि स्थातुं न शक्नुवन्ति |

6 यावन्तो लोका युगधारिणो दासाः सन्ति ते स्वस्वस्वामिनं
 पूर्णसमादरयोग्यं मन्यन्तां नो येद् एश्वरस्य नाम्न उपदेशस्य य निन्दा
 सभमविष्यति | 2 येषाञ्च स्वामिनो विश्वासिनः भवन्ति तैस्ते भ्रातृत्वात्
 नावज्ञेयाः किन्तु ते कर्मफलभोगिनो विश्वासिनः प्रियाश्च भवन्तीति हेतोः

સેવનીયા એવ, ત્વમ્ એતાનિ શિક્ષય સમુપદિશ ચ | ૩ યઃ કશ્ચિદ્ ઇતરશિક્ષાં
 કરોતિ, અસ્માકં પ્રભો ર્યોશુશ્રીષ્ટસ્ય હિતવાક્યાનીશ્વરભક્તે યોગ્યાં શિક્ષાઞ્ચ
 ન સ્વીકરોતિ | ૪ સ દર્પધ્માતઃ સર્વથા જ્ઞાનહીનશ્ચ વિવાદૈર્ વાગ્યુદ્ધૈશ્ચ
 રોગયુક્તશ્ચ ભવતિ | ૫ તાદૃશાદ્ ભાવાદ્ ઈર્ષ્યાવિરોધાપવાદ્દુષ્ટાસૂયા
 ભ્રષ્ટમનસાં સત્યજ્ઞાનહીનાનામ્ ઈશ્વરભક્તિં લાભોપાયમ્ ઇવ મન્યમાનાનાં
 લોકાનાં વિવાદાશ્ચ જાયન્તે તાદૃશેભ્યો લોકેભ્યસ્ત્વં પૃથક્ તિષ્ઠ | ૬
 સંયતેચ્છયા યુક્તા યેશ્વરભક્તિઃ સા મહાલાભોપાયો ભવતીતિ સત્યં |
 ૭ એતજ્જગત્પ્રવેશનકાલેડસ્માભિઃ કિમપિ નાનાયિ તત્તયજનકાલેડપિ
 કિમપિ નેતું ન શક્ષ્યત ઇતિ નિશ્ચિતં | ૮ અતએવ ખાધાન્યાચ્છાદનાનિ
 ચ પ્રાપ્યાસ્માભિઃ સન્તુષ્ટૈર્ ભવિતવ્યં | ૯ યે તુ ધનિનો ભવિતું યેષ્ટન્તે તે
 પરીક્ષાયામ્ ઉન્માથે પતન્તિ યે ચાભિલાષા માનવાન્ વિનાશે નરકે ચ
 મજ્જયન્તિ તાદૃશેષ્વજ્ઞાનાહિતાભિલાષેષ્વપિ પતન્તિ | ૧૦ યતોડર્થસ્પૃહા
 સર્વેષાં દુરિતાનાં મૂલં ભવતિ તામવલમ્બ્ય કેચિદ્ વિશ્વાસાદ્ અભ્રંશન્ત
 નાનાકલેશૈશ્ચ સ્વાન્ અવિધ્યન્ | ૧૧ હે ઈશ્વરસ્ય લોક ત્વમ્ એતેભ્યઃ પલાય
 ધર્મ ઈશ્વરભક્તિર્ વિશ્વાસઃ પ્રેમ સહિષ્ણુતા ક્ષાન્તિશ્ચૈતાન્યાચર | ૧૨
 વિશ્વાસરૂપમ્ ઉત્તમયુદ્ધં કુરુ, અનન્તજીવનમ્ આલમ્બસ્વ યતસ્તદર્થં ત્વમ્
 આહૂતો ડભવઃ, બહુસાક્ષિણાં સમક્ષઞ્ચોત્તમાં પ્રતિજ્ઞાં સ્વીકૃતવાન્ | (aiṅnios
 g166) ૧૩ અપરં સર્વેષાં જીવયિતુરીશ્વરસ્ય સાક્ષાદ્ યશ્ચ ખ્રીષ્ટો યીશુઃ
 પન્તીયપીલાતસ્ય સમક્ષમ્ ઉત્તમાં પ્રતિજ્ઞાં સ્વીકૃતવાન્ તસ્ય સાક્ષાદ્ અહં
 ત્વામ્ ઇદમ્ આજ્ઞાપયામિ | ૧૪ ઈશ્વરેણ સ્વસમયે પ્રકાશિતવ્યમ્ અસ્માકં
 પ્રભો ર્યોશુશ્રીષ્ટસ્યાગમનં યાવત્ ત્વયા નિષ્કલઙ્કન્ત્વેન નિર્દોષત્વેન ચ વિધી
 રક્ષ્યતાં | ૧૫ સ ઈશ્વરઃ સચ્ચિદાનન્દઃ, અદ્વિતીયસમ્રાટ્, રાજાં રાજા, પ્રભૂનાં
 પ્રભુઃ, ૧૬ અમરતાયા અદ્વિતીય આકરઃ, અગમ્યતેજોનિવાસી, મર્ત્યાનાં
 કેનાપિ ન દૃષ્ટઃ કેનાપિ ન દૃશ્યશ્ચ | તસ્ય ગૌરવપરાક્રમૌ સદાતનૌ ભૂયાસ્તાં |
 આમેન્ | (aiṅnios g166) ૧૭ ઇહલોકે યે ધનિનસ્તે ચિત્તસમુન્નર્તિં ચપલે ધને
 વિશ્વાસઞ્ચ ન કુર્વતાં કિન્તુ ભોગાર્થમ્ અસ્મભ્યં પ્રચુરત્વેન સર્વદાતા (aiṅn
 g165) ૧૮ યોડમર ઈશ્વરસ્તસ્મિન્ વિશ્વસન્તુ સદાચારં કુર્વન્તુ સત્કર્મધનેન
 ધનિનો સુકલા દાતારશ્ચ ભવન્તુ, ૧૯ યથા ચ સત્યં જીવનં પાપ્નુયુસ્તથા
 પારત્રિકામ્ ઉત્તમસમ્પદં સચ્ચિન્વન્ત્વેતિ ત્વયાદિશ્યન્તાં | ૨૦ હે તીમથિય,

त्वम् ऒपनिधिं गोपय काल्पनिकविधाया अपवित्रं प्रलापं विरोधोक्तिञ्च
त्यज य, 21 यतः कतिपया लोकास्तां विधाभवलम्ब्य विश्वासाद् ब्रष्टा
अभवन्। प्रसादस्तव सहायो भूयात्। आभेन्।

२ तीमथियः

1 श्रीष्टेन यीशुना या ज्वनस्य प्रतिज्ञा तामधीश्वरस्येच्छया यीशोः
श्रीष्टस्यैकः प्रेरितः पौलोडलं स्वकीयं प्रियं धर्मपुत्रं तीमथियं प्रति पत्रं
लिभामि | 2 तात ईश्वरोऽस्माकं प्रभु र्थीशुश्रीष्टश्च त्वयि प्रसादं दयां
शान्तिञ्च क्रियास्तां | 3 अहम् आ पूर्वपुरुषात् यम् ईश्वरं पवित्रमनसा सेवे
तं धन्यं वदनं कथयामि, अहम् अहोरात्रं प्रार्थनासमये त्वां निरन्तरं स्मरामि |
4 यश्च विश्वासः प्रथमे लोयीनामिकायां तव मातामह्याम् उनीडीनामिकायां
मातरि यातिष्ठत् तवान्तरेऽपि तिष्ठतीति मन्ये 5 तव तं निष्कपटं विश्वासं
मनसि कुर्वन् तवाश्रुपातं स्मरन् यथानन्देन प्रङ्गलो भवेयं तदर्थं तव दर्शनम्
आकाङ्क्षे | 6 अतो हेतो र्मम हस्तार्पणेन लब्धो य ईश्वरस्य वरस्त्वयि
विधत्ते तम् उज्ज्वालयितुं त्वां स्मारयामि | 7 यत ईश्वरोऽस्मत्स्यं
भयजनकम् आत्मानम् अदत्त्वा शक्तिप्रेमसतर्कतानाम् आकरम् आत्मानं
दत्तवान् | 8 अतयेवास्माकं प्रभुमधि तस्य वन्देदासं मामधि य प्रमाणं
दातुं न त्रपस्व किन्वीश्वरीयशक्त्या सुसंवादेस्य कृते दुःखस्य सलभागी
भव | 9 सोऽस्मान् परित्राणपात्राणि कृतवान् पवित्रेणाह्वानेनाहूतवांश्च;
अस्मत्कर्म्महेतुनेति नहि स्वीयनिर्गुणस्य प्रसादस्य य कृते तत् कृतवान् |
स प्रसादः सृष्टेः पूर्वकाले श्रीष्टेन यीशुनास्मत्स्यम् अदायि, (aiōnios g166)
10 किन्त्वधुनास्माकं परित्रातु र्थीशोः श्रीष्टस्यागमनेन प्राकाशत | श्रीष्टो मृत्युं
पराजितवान् सुसंवादेन य ज्वनम् अमरताञ्च प्रकाशितवान् | 11 तस्य
घोषयिता दूतश्चान्यजातीयानां शिक्षकश्चाहं नियुक्तोऽस्मि | 12 तस्मात्
कारणात् ममायं क्लेशो भवति तेन मम लज्जा न जायते यतोऽहं यस्मिन्
विश्वसितवान् तमवगतोऽस्मि मलादिनं यावत् ममोपनिधे गोपनस्य
शक्तिस्तस्य विधत्त इति निश्चितं जानामि | 13 हितदायकानां वाक्यानाम्
आदर्शरूपेण मत्तः श्रुताः श्रीष्टे यीशौ विश्वासप्रेम्नोः कथा धारय | 14
अपरम् अस्मदन्तर्वासिना पवित्रेणात्मना तामुत्तमाम् उपनिधिं गोपय | 15
आशियादेशीयाः सर्वे मां त्यक्तवन्त इति त्वं जानासि तेषां मध्ये कूगिल्लो
हर्भगिनिश्च विधत्ते | 16 प्रभुरनीषिङ्गरस्य परिवारान् प्रति कृपां विदधातु
यतः स पुनः पुन र्माम् आध्यायितवान् 17 मम शृङ्खलेन न त्रपित्वा
रोमानगरे उपस्थितिसमये यत्नेन मां मृगयित्वा ममोद्देशं प्राप्तवान् | 18

अतो विचारदिने स यथा प्रभोः कृपाभाजनं भवेत् तादृशं वरं प्रभुस्तस्मै
 देयात् | एङ्घ्रिषनगरेऽपि स कति प्रकारैर्भाम् उपकृतवान् तत् त्वं सम्यग्
 वेत्सि |

2 हे मम पुत्र, प्रीष्टयीशुतो योऽनुग्रहस्तस्य बलेन त्वं बलवान् भव | 2
 अपरं बहुभिः साक्षिभिः प्रमाणीकृतां यां शिक्षां श्रुतवानसि तां विश्वास्येषु
 परस्मै शिक्षादाने निपुणेषु य लोकेषु समर्पय | 3 त्वं यीशुप्रीष्टस्योत्तमो
 योद्धेव क्लेशं सत्स्य | 4 यो युद्धं करोति स सांसारिके व्यापारे मग्नो न
 भवति किन्तु स्वनियोजयित्रे रोयितुं येष्टते | 5 अपरं यो मल्लै र्युध्यति
 स यदि नियमानुसारेण न युध्यति तर्हि किरीटं न लप्स्यते | 6 अपरं
 यः कृषीवलः कर्म करोति तेन प्रथमेन कुलभागिना भवितव्यं | 7 मया
 युध्यते तत् त्वया बुध्यतां यतः प्रभुस्तुभ्यं सर्वत्र बुद्धिं दास्यति | 8 मम
 सुसंवाद्यस्य वयनानुसाराद् दायूद्धंशीयं मृतगाणमध्याद् उत्थापितञ्च यीशुं
 प्रीष्टं स्मर | 9 तत्सुसंवाद्यकाराणां अहं दुष्कर्म्मव बन्धनदशापर्यन्तं क्लेशं
 भुञ्जे किन्त्वीश्वरस्य वाक्यम् अबद्धं तिष्ठति | 10 प्रीष्टेन यीशुना यद्
 अनन्तगौरवसहितं परित्राणं जायते तदभिरुचिर्ते लोकेऽपि यत् लभ्येत
 तदर्थमहं तेषां निमित्तं सर्वाण्येतानि सहे | (aiōnios g166) 11 अपरम् अेषा
 भारती सत्या यदि वयं तेन सार्द्धं म्रियामहे तर्हि तेन सार्द्धं श्रुविद्यामः,
 यदि य क्लेशं सखामहे तर्हि तेन सार्द्धं राजत्वमपि करिष्यामहे | 12
 यदि वयं तम् अनङ्गीकुर्म्मस्तर्हि सोऽस्मान्प्यनङ्गीकरिष्यति | 13 यदि
 वयं न विश्वासामस्तर्हि स विश्वास्यस्तिष्ठति यतः स्वम् अपह्नोतुं न
 शक्नोति | 14 त्वमेतानि स्मारयन् ते यथा निष्कलं श्रोतृणां ब्रंशजनकं
 वाग्युद्धं न कुर्व्यस्तथा प्रभोः समक्षं दृढं विनीयादिश | 15 अपरं त्वम्
 ईश्वरस्य साक्षात् स्वं परीक्षितम् अनिन्दनीयकर्मकारिणञ्च सत्यमतस्य
 वाक्यानां सद्विभजने निपुणञ्च दर्शयितुं यतस्व | 16 किन्त्वपवित्रा
 अनर्थककथा दूरीकुरु यतस्तदालम्बिन उत्तरोत्तरम् अधर्म्मो वर्द्धिष्यन्ते, 17
 तेषाञ्च वाक्यं गलितक्षतवत् क्षयवर्द्धको भविष्यति तेषां मध्ये दुमिनायः
 झिलीतश्चेतिनामानौ द्वौ जनौ सत्यमताद् ब्रष्टौ जातौ, 18 मृतानां पुनरुत्थिति
 र्व्यतीतेति वदन्तौ केषाञ्चिद् विश्वासम् उत्पाटयतश्च | 19 तथापीश्वरस्य
 भित्तिमूलम् अयलं तिष्ठति तस्मिंश्चेयं लिपिर्मुद्राङ्किता विधते | यथा,

જાનાતિ પરમેશસ્તુ સ્વકીયાન્ સર્વમાનવાન્ | અપગચ્છેદ્ અધર્માચ્ય
 યઃ કશ્ચિત્ પ્રીષ્ટનામકૃત્ | | 20 કિન્તુ ભૃહન્નિકેતને કેવલ સુવાર્ણમયાનિ
 રૌપ્યમયાણિ ચ ભાજનાનિ વિધન્ત ઇતિ તર્હિ કાષ્ઠમયાનિ મૃણ્મયાન્યપિ
 વિધન્તે તેષાઞ્ચ કિચન્તિ સમ્માનાય કિચન્તપમાનાય ચ ભવન્તિ | 21
 અતો યદિ કશ્ચિદ્ એતાદૃશેભ્યઃ સ્વં પરિષ્કરોતિ તર્હિ સ પાવિતં પ્રભોઃ
 કાર્યયોગ્યં સર્વસત્કાર્યાર્થોપયુક્તં સમ્માનાર્થકઞ્ચ ભાજનં ભવિષ્યતિ |
 22 યૌવનાવસ્થાયા અભિલાષાસ્ત્વયા પરિત્યજ્યન્તાં ધર્મો વિશ્વાસઃ
 પ્રેમ યે ચ શુચિમનોભિઃ પ્રભુમ્ ઉદિશ્ય પ્રાર્થનાં કુર્વ્યતે તૈઃ સાર્દ્ધમ્
 ઐક્યભાવશ્ચૈતેષુ ત્વયા યત્નો વિધીયતાં | 23 અપરં ત્વમ્ અનર્થકાન્
 અજ્ઞાનાંશ્ચ પ્રશ્નાન્ વાગ્યુદ્ધોત્પાદકાન્ જ્ઞાત્વા દૂરીકુરુ | 24 યતઃ પ્રભો દર્સિને
 યુદ્ધમ્ અકર્ત્વ્યં કિન્તુ સર્વાન્ પ્રતિ શાન્તેન શિક્ષાદાનેચ્છુકેન સહિષ્ણુના ચ
 ભવિતવ્યં, વિપક્ષાશ્ચ તેન નમ્રત્વેન ચેતિતવ્યાઃ | 25 તથા કૃતે યદીશ્વરઃ
 સત્યમતસ્ય જ્ઞાનાર્થં તેભ્યો મનઃપરિવર્તનરૂપં વરં દદાતુ, 26 તર્હિ તે યેન
 શયતાનેન નિજાભિલાષસાધનાય ધૃતાસ્તસ્ય જાલાત્ ચેતનાં પ્રાપ્યોદ્ધારં
 લબ્ધું શક્ચન્તિ |

3 ચરમદિનેષુ કલેશજનકાઃ સમયા ઉપસ્થાસ્યન્તીતિ જાનીહિ | 2
 યતસ્તાત્કાલિકા લોકા આત્મપ્રેમિણો ડર્થપ્રેમિણ આત્મશલાધિનો
 ડભિમાનિનો નિન્દકાઃ પિત્રોરનાજ્ઞાગ્રાહિણઃ કૃતઘ્ના અપવિત્રાઃ 3
 પ્રીતિવર્જિતા અસન્ધેયા મૃષાપવાદિનો ડજિતેન્દ્રિયાઃ પ્રચાર્ડા ભદ્રદ્વેષિણો 4
 વિશ્વાસઘાતકા દુઃસાહસિનો દર્પઘ્માતા ઈશ્વરાપ્રેમિણઃ કિન્તુ સુખપ્રેમિણો
 5 ભક્તવેશાઃ કિન્ત્વસ્વીકૃતભક્તિગુણા ભવિષ્યન્તિ; એતાદૃશાનાં લોકાનાં
 સંમર્ગા પરિત્યજ | 6 યતો યે જનાઃ પ્રચ્છન્નં ગેહાન્ પ્રવિશન્તિ પાપૈ
 ભાર્ગસ્તા નાનાવિધાભિલાષૈશ્રાલિતા યાઃ કામિન્યો 7 નિત્યં શિક્ષન્તે કિન્તુ
 સત્યમતસ્ય તત્ત્વજ્ઞાનં પ્રાપ્તું કદાચિત્ ન શક્નુવન્તિ તા દાસીવદ્ વશીકુર્વ્યતે
 ય તે તાદૃશા લોકાઃ | 8 યાન્નિ ચામ્ષિશ્ચ યથા મૂસમં પ્રતિ વિપક્ષત્વમ્
 અકુરુતાં તથૈવ ભ્રષ્ટમનસો વિશ્વાસવિષયે ડગ્રાહ્યાશ્ચૈતે લોકા અપિ સત્યમતં
 પ્રતિ વિપક્ષતાં કુર્વન્તિ | 9 કિન્તુ તે ભૃહ્દૂરમ્ અગ્રસરા ન ભવિષ્યન્તિ
 યતસ્તયો મૂઢતા યદ્વત્ તદ્વદ્ એતેષામપિ મૂઢતા સર્વદૃશ્યા ભવિષ્યતિ |
 10 મમોપદેશઃ શિષ્ટતામિપ્રાયો વિશ્વાસો ધર્ચ્ય પ્રેમ સહિષ્ણુતોપદ્રવઃ

क्लेशा 11 आन्तियभियायाम् षडनिये लूत्रायाञ्च मां प्रति यधद् अघटत
यांश्रोपद्रवान् अडम् असडे सर्वमेतत् त्वम् अवगतोऽसि किन्तु तत्सर्वतः
प्रभु मर्मां उद्धृतवान्। 12 परन्तु यावन्तो लोकाः श्रीष्टेन यीशुनेश्वरभक्तिम्
आचरितुम् ष्ट्यन्ति तेषां सर्वेषाम् उपद्रवो भविष्यति। 13 अपरं पापिष्ठाः
भलाश्च लोकाः ब्राम्यन्तो ब्रमयन्तश्चोत्तरोत्तरं दृष्टत्वेन वर्द्धिष्यन्ते। 14 किन्तु
त्वं यद् यद् अशिक्षथाः, यय्य त्वयि समर्पितम् अतूत् तस्मिन् अवतिष्ठ,
यतः कस्मात् शिक्षां प्राप्तोऽसि तद् वेत्सि; 15 यानि य धर्मशास्त्राणि
श्रीष्टे यीशौ विश्वासेन परित्राणप्राप्तये त्वां ज्ञानिनं कर्तुं शक्नुवन्ति तानि
त्वं शैशवकालाद् अवगतोऽसि। 16 तत् सर्वं शास्त्रम् ष्ट्वरस्यात्मना
दत्तं शिक्षायै दोषबोधाय शोधनाय धर्मविनयाय य इलयूक्तं भवति 17
तेन येश्वरस्य लोको निपुणः सर्वस्मै सत्कर्माणो सुसज्जश्च भवति।

4 ष्ट्वरस्य गोयरे यश्च यीशुः श्रीष्टः स्वीयागमनकाले स्वराजत्वेन
श्रुवतां मृतानाञ्च लोकानां विचारं करिष्यति तस्य गोयरे ऽहं त्वाम्
ऽहं दृढम् आज्ञापयामि। 2 त्वं वाक्यं घोषय कालेऽकाले योत्सुको भव
पूर्णाया सडिष्णुतया शिक्षया य लोकान् प्रबोधय भर्त्सय विनयस्व
य। 3 यत अेतादृशः समय आयाति यस्मिन् लोका यथार्थम्
उपदेशम् असहमानाः कर्णकण्डूयनविशिष्टा भूत्वा निजाभिलाषात्
शिक्षकान् संग्रहीष्यन्ति 4 सत्यमताय्य श्रोत्राणि निवर्त्य विपथगामिनो
भूत्वोपाभ्यानेषु प्रवर्तिष्यन्ते; 5 किन्तु त्वं सर्वविषये प्रबुद्धो भव दुःखभोगं
स्वीकुरु सुसंवाद्यप्रयारकस्य कर्म्म साधय निजपरियर्था पूर्णत्वेन कुरु
य। 6 मम प्राणानाम् उत्सर्गो भवति मम प्रस्थानकालश्रोपातिष्ठत्। 7
अडम् उत्तमयुद्धं कृतवान् गन्तव्यमार्गस्यान्तं यावद् धावितवान् विश्वासञ्च
रक्षितवान्। 8 शेषं पुण्यमुकुटं मर्ध्यं रक्षितं विधत्ते तय्य तस्मिन् मडादिने
यथार्थविचारकेण प्रभुना मह्यं दायिष्यते केवलं मह्यम् ष्टि नडि किन्तु
यावन्तो लोकास्तस्यागमनम् आकाङ्क्षन्ते तेभ्यः सर्वेभ्यो ऽपि दायिष्यते।
9 त्वं त्वरया भत्समीपम् आगन्तुं यतस्व, 10 यतो दीमा अैडिकसंसारम्
ऽहमानो मां परित्यज्य थिषलनीडीं गतवान् तथा ड्रीष्कि गर्ालातियां
गतवान् तीतश्च दाल्मातियां गतवान्। (aiōn g165) 11 केवलो लूको
मया सार्द्धं विधत्ते। त्वं मार्कं सङ्गिनं कृत्वागच्छ यतः स परियर्था

મમોપકારી ભવિષ્યતિ, 12 તુષ્ટિકઞ્ચાહમ્ ઇદ્ધિષનગરં પ્રેષિતવાન્ | 13 યદ્
 આચ્છાદનવસ્ત્રં ત્રોયાનગરે કાર્પસ્ય સન્નિઘૌ મયા નિક્ષિપ્તં ત્વમાગમનસમયે
 તત્ પુસ્તકાનિ ચ વિશેષતશ્ચાર્મ્મગ્રન્થાન્ આનય | 14 કાંસ્યકારઃ સિકન્દરો
 મમ બહ્વનિષ્ઠં કૃતવાન્ પ્રભુસ્તસ્ય કર્મ્મણાં સમુચિતફલં દદાતુ | 15 ત્વમપિ
 તસ્માત્ સાવધાનાસ્તિષ્ઠ યતઃ સોડસ્માકં વાક્યાનામ્ અતીવ વિપક્ષો જાતઃ |
 16 મમ પ્રથમપ્રત્યુત્તરસમયે કોડપિ મમ સહાયો નાભવત્ સર્વે માં પર્યત્યજન્
 તાન્ પ્રતિ તસ્ય દોષસ્ય ગણના ન ભૂયાત્; 17 કિન્તુ પ્રભુ મમ સહાયો
 ડભવત્ યથા ચ મયા ઘોષણા સાધ્યેત ભિન્નજાતીયાશ્ચ સર્વે સુસંવાદં
 શૃગુયુસ્તથા મહ્યં શક્તિમ્ અદદાત્ તતો ડહં સિંહસ્ય મુખાદ્ ઉદ્દૃતઃ | 18
 અપરં સર્વસ્માદ્ દુષ્કર્મ્મતઃ પ્રભુ માર્મ્ ઉદ્ધરિષ્યતિ નિજસ્વર્ગીયરાજ્યં નેતું
 માં તારયિષ્યતિ ચ | તસ્ય ઘન્યવાદઃ સદાકાલં ભૂયાત્ | આમેન્ | (aiōn
 g165) 19 ત્વં પ્રિષ્કામ્ આક્કિલમ્ અનીષિક્કરસ્ય પરિજનાંશ્ચ નમસ્કુરુ |
 20 ઇરાસ્તઃ કરિન્થનગરે ડતિષ્ઠત્ ત્રિક્કિમશ્ચ પીડિતત્વાત્ મિલીતનગરે મયા
 વ્યહીયત | 21 ત્વં હેમન્તકાલાત્ પૂર્વમ્ આગન્તું યતસ્વ | ઉબૂલઃ પૂદિ લીંનઃ
 ક્લૌદિયા સર્વે ભ્રાતરશ્ચ ત્વાં નમસ્કુર્વ્યતે | 22 પ્રભુ ર્યીશુઃ પ્રીષ્ટસ્તવાત્મના
 સહ ભૂયાત્ | યુષ્માસ્વનુગ્રહો ભૂયાત્ | આમેન્ |

तीतः

1 अनन्तज्ज्वनस्याशातो जाताया ईश्वरभक्ते योऽयस्य सत्यमतस्य यत् तत्त्वज्ञानं यश्च विश्वास ईश्वरस्याभिरुच्यितलोकैर्लभ्यते तदर्थं (aiōnios g166) 2 यीशुप्रीष्टस्य प्रेरित ईश्वरस्य दासः पौलोऽहं साधारणविश्वासात् मम प्रकृतं धर्मपुत्रं तीतं प्रति लिखामि। 3 निष्कपट ईश्वर आदिकालात् पूर्वं तत् ज्वनं प्रतिज्ञातवान् स्वनिर्गमितसमये य घोषणया तत् प्रकाशितवान्। 4 मम त्रातुरीश्वरस्याज्ञया य तस्य घोषणं मयि समर्पितम् अभूत्। अस्माकं तात ईश्वरः परित्राता प्रभु र्यीशुप्रीष्टश्च तुभ्यम् अनुग्रहं द्यां शान्तिञ्च वितरतु। 5 त्वं यद् असम्पूर्णाकार्याणि सम्पूरये र्भदीयादेशास्य प्रतिनगरं प्राचीनगणान् नियोजयेस्तदर्थमहं त्वां क्रीत्युपद्वीपे स्थापयित्वा गतवान्। 6 तस्माद् यो नरो ऽनिन्दित अेकस्या योषितः स्वामी विश्वासिनाम् अपययस्यावाध्यत्वस्य वा दोषेणालिप्तानाञ्च सन्तानानां जनको भवति स अेव योग्यः। 7 यतो हेतोरधक्षेणेश्वरस्य गृहाधक्षेणोवानिन्दनीयेन भवितव्यं। तेन स्वेच्छायागिणा क्रोधिना पानासक्तेन प्रहारकेण लोभिना वा न भवितव्यं 8 किन्त्वतिथिसेवकेन सल्लोकानुरागिणा विनीतेन न्यायेन धार्मिकेण जितेन्द्रियेण य भवितव्यं, 9 उपदेशे य विश्वस्तं वाक्यं तेन धारितव्यं यतः स यद् यथार्थनोपदेशेन लोकान् विनेतुं विघ्नकारिणश्च निरुत्तरान् कर्तुं शक्नुयात् तद् आवश्यकं। 10 यतस्ते भवो ऽवाध्या अनर्थकवाक्यवादिनः प्रवञ्चकाश्च सन्ति विशेषतश्छिन्नत्वयां मध्ये केचित् तादृशा लोकाः सन्ति। 11 तेषाञ्च वाग्रोध आवश्यको यतस्ते कुत्सितलाभस्याशयानुचितानि वाक्यानि शिक्षयन्तो निम्बिलपरिवाराणां सुमतिं नाशयन्ति। 12 तेषां स्वदेशीय अेको भविष्यद्वादी वयनमिदमुक्तवान्, यथा, क्रीतीयमानवाः सर्वे सदा कापट्यवादिनः। लिंञ्जन्तुसमानास्ते ऽलसाश्चोदरभारतः। 13 साक्ष्यमेतत् तथ्यं, अतो हेतोस्त्वं तान् गाढं भर्त्सय ते य यथा विश्वासे स्वस्था भवेयु 14 र्थिडूदीयोपाभ्यानेषु सत्यमतभ्रष्टानां मानवानाम् आज्ञासु य मनांसि न निवेशयेयुस्तथादिश। 15 शुयीनां कृते सर्वाण्येव शुयीनि भवन्ति किन्तु कलङ्कितानाम् अविश्वासिनाञ्च कृते शुयि किमपि न भवति यतस्तेषां बुद्धयः संवेदाश्च कलङ्किताः सन्ति। 16 ईश्वरस्य

ज्ञानं ते प्रतिजानन्ति किन्तु कर्मभिस्तद् अनङ्गीकुर्वन्ते यतस्ते गर्हिता
अनाज्ञाग्राहिणः सर्वसत्कर्मणश्चायोग्याः सन्ति।

2 यथार्थस्योपदेशस्य वाक्यानि त्वया कथ्यन्तां 2 विशेषतः प्राचीनलोका
यथा प्रबुद्धा धीरा विनीता विश्वासे प्रेम्नि सङ्घिषुतायाञ्च स्वस्था
भवेयुस्तद्वत् 3 प्राचीनयोषितोऽपि यथा धर्मयोग्यम् आचारं कुर्युः
परनिन्दका बहुमधपानस्य निघ्नाश्च न भवेयुः 4 किन्तु सुशिक्षाकारिण्यः
सत्यं ईश्वरस्य वाक्यं यत् न निन्देत तदर्थं युवतीः सुशीलताम्
अर्थतः पतिस्नेहम् अपत्यस्नेहं 5 विनीतिं शुचित्वं गृह्णीतृत्वं
सौजन्यं स्वामिनिघ्नआदिशेषुस्तथा त्वया कथ्यतां। 6 तद्वद् यूनोऽपि
विनीतये प्रबोधय। 7 त्वञ्च सर्वविषये स्वं सत्कर्मणां दृष्टान्तं दर्शय
शिक्षायाञ्चाविकृतत्वं धीरतां यथार्थं 8 निर्दोषञ्च वाक्यं प्रकाशय तेन विपक्षो
युष्माकम् अपवादस्य किमपि छिद्रं न प्राप्य त्रपिष्यते। 9 दासाश्च यत्
स्वप्रभूनां निघ्नाः सर्वविषये तुष्टिजनकाश्च भवेयुः प्रत्युत्तरं न कुर्युः 10
किमपि नापहरेयुः किन्तु पूर्णां सुविश्वस्ततां प्रकाशयेयुरिति तान् आदिश।
यत अवेम्प्रकारेणास्मकं त्रातुरीश्वरस्य शिक्षा सर्वविषये तैर्भूषितव्या। 11
यतो डेतोस्त्राणाञ्चक ईश्वरस्यानुग्रहः सर्वान् मानवान् प्रत्युदितवान् 12
स यास्मान् ईदं शिक्षति यद् वयम् अधर्मं सांसारिकाभिलाषांश्चानङ्गीकृत्य
विनीतत्वेन न्यायेनेश्वरभक्त्या येऽलोके आयु र्यापयामः, (aiṅ g165) 13
परमसुभस्याशाम् अर्थतो ऽस्माकं भवत ईश्वरस्य त्राणकर्तुं र्यैशुश्रीष्टस्य
प्रभावस्योदयं प्रतीक्षामहे। 14 यतः स यथास्मान् सर्वस्माद् अधर्मात्
भोययित्वा निजाधिकारस्वरूपं सत्कर्मसूत्सुकम् अेकं प्रजावर्गं पावयेत्
तदर्थम् अस्माकं कृते आत्मदानं कृतवान्। 15 अेतानि भाषस्व पूर्णसामर्थ्येन
यादिश प्रबोधय य, कोऽपि त्वां नावमन्यतां।

3 ते यथा देशाधिपानां शासकानाञ्च निघ्ना आज्ञाग्राहिणश्च सर्वस्मै
सत्कर्मणो सुसज्जान् भवेयुः 2 क्मपि न निन्देयु निर्विशेषिनः
क्षान्ताश्च भवेयुः सर्वान् प्रति य पूर्णं भूद्वत्वं प्रकाशयेयुश्चेति तान्
आदिश। 3 यतः पूर्वं वयमपि निर्वर्षा अनाज्ञाग्राहिणो ब्रान्ता
नानाभिलाषाणां सुभानाञ्च दासेया दृष्टत्वेर्ष्याचारिणो धृष्टिताः परस्परं
द्वेषिणश्चाभवामः। 4 किन्त्वस्माकं त्रातुरीश्वरस्य या दया मर्त्यानां

પ્રતિ ચ યા પ્રીતિસ્તસ્યાઃ પ્રાદુર્ભાવિ જાતે 5 વયમ્ આત્મકૃતેભ્યો
 ધર્મકર્મભ્યસ્તન્નહિ કિન્તુ તસ્ય કૃપાતઃ પુનર્જન્મરૂપેણ પ્રક્ષાલનેન
 પ્રવિત્રસ્યાત્મનો નૂતનીકરણેન ચ તસ્માત્ પરિત્રાણાં પ્રાપ્તાઃ 6 સ
 ચાસ્માકં ત્રાત્રા યીશુષ્રીષ્ટેનાસ્મદુપરિ તમ્ આત્માનં પ્રચુરત્વેન વૃષ્ટવાન્ | 7
 ઇત્યં વયં તસ્યાનુગ્રહેણ સપુણ્યીભૂય પ્રત્યાશયાનન્તજીવનસ્યાધિકારિણો
 જાતાઃ | (aiōnios g166) 8 વાક્યમેતદ્ વિશ્વસનીયમ્ અતો હેતોરીશ્વરે યે
 વિશ્વસિતવન્તસ્તે યથા સત્કર્માણ્યનુતિષ્ઠેયુસ્તથા તાન્ દૃઢમ્ આજ્ઞાપયેતિ
 મમાભિમતં | તાન્થેવોત્તમાનિ માનવેભ્યઃ ફલદાનિ ચ ભવન્તિ | 9 મૂઢેભ્યઃ
 પ્રશ્નવંશાવલિવિવાદેભ્યો વ્યવસ્થાયા વિતાણ્ડાભ્યશ્ચ નિવર્તસ્વ યતસ્તા
 નિષ્ફલા અનર્થકાશ્ચ ભવન્તિ | 10 યો જનો ભિભિત્સુસ્તમ્ એકવારં દ્વિર્વા
 પ્રબોધ્ય દૂરીકુરુ, 11 યતસ્તાદૃશો જનો વિપથગામી પાપિષ્ઠ આત્મદોષકશ્ચ
 ભવતીતિ ત્વયા જ્ઞાયતાં | 12 યદાહમ્ આર્તિમાં તુષ્ટિકં વા તવ સમીપં
 પ્રેષયિષ્યામિ તદા ત્વં નીકપલૌ મમ સમીપમ્ આગન્તું યતસ્વ યતસ્તત્રૈવાહં
 શીતકાલં યાપયિતું મતિમ્ અકાર્ષં | 13 વ્યવસ્થાપકઃ સીના આપલ્લુશ્ચૈતયોઃ
 કસ્યાપ્યભાવો યન્ન ભવેત્ તદર્થં તૌ યત્નેન ત્વયા વિસૃજ્યેતાં | 14
 અપરમ્ અસ્મદીયલોકા યન્નિષ્ફલા ન ભવેયુસ્તદર્થં પ્રયોજનીયોપકારાયા
 સત્કર્માણ્યનુષ્ઠાતું શિક્ષન્તાં | 15 મમ સક્તિનઃ સવ્યે ત્વાં નમસ્કુર્વ્યતે |
 યે વિશ્વાસાદ્ અસ્માસુ પ્રીયન્તે તાન્ નમસ્કુરુઃ; સર્વેષુ યુષ્માસ્વનુગ્રહો
 ભૂયાત્ | આમેન્ |

इलोमोनः

1 श्रीष्टस्य यीशो बन्दिदासः पौलस्तीथियनामा भ्राता य प्रियं सडकारिणं
इलीमोनं 2 प्रियाम् आप्पियां सडसेनाम् आप्पिणं इलीमोनस्य गृहे
स्थितां समितिञ्च प्रति पत्रं लिखतः | 3 अस्माकं तात ईश्वरः प्रभु
यीशुश्रीष्टश्च युष्मान् प्रति शान्तिम् अनुग्रहञ्च क्रियास्तां | 4 प्रभुं यीशुं प्रति
सर्वान् पवित्रलोकान् प्रति य तव प्रेमविश्वासयो वृत्तान्तं निशम्यादं 5
प्रार्थनासमये तव नामोच्यारयन् निरन्तरं भमेश्वरं धन्यं वदामि | 6 अस्मासु
यद्यत् सौजन्यं विद्यते तत् सर्वं श्रीष्टं यीशुं यत् प्रति भवतीति ज्ञानाय तव
विश्वासमूलिका दानशीलता यत् सङ्गला भवेत् तद्वदम् ईच्छामि | 7 हे
भ्रातः, त्वया पवित्रलोकानां प्राण आप्यायिता अभवन् अतस्मात् तव
प्रेमास्माकं महान् आनन्दः सान्त्वना य जातः | 8 त्वया यत् कर्तव्यं तत्
त्वाम् आज्ञापयितुं यद्यद्यं श्रीष्टेनातीवोत्सुको भवेयं तथापि वृद्ध 9 एदानीं
यीशुश्रीष्टस्य बन्दिदासश्चैवम्भूतो यः पौलः सोऽदं त्वां विनेतुं वरं मन्ये |
10 अतः शृङ्खलबद्धोऽदं यमजनयं तं मदीयतनयम् ओनीषिमम् अधि त्वां
विनये | 11 स पूर्वं तवानुपकारक आसीत् किन्तिवदानीं तव मम योपकारी
भवति | 12 तमेवादं तव समीपं प्रेषयामि, अतो मदीयप्राणस्वरूपः स
त्वयानुगृह्यतां | 13 सुसंवाहस्य कृते शृङ्खलबद्धोऽदं परियारकमिव तं
स्वसन्निधौ वर्तयितुम् ईच्छे | 14 किन्तु तव सौजन्यं यद् भलेन न भूत्वा
स्वेच्छायाः इलं भवेत् तदर्थं तव सम्मतिं विना किमपि कर्तव्यं नामन्ये | 15
को जानाति क्षणकालार्थं त्वत्तस्तस्य विच्छेदोऽभवद् अतस्यायम् अभिप्रायो
यत् त्वम् अनन्तकालार्थं तं लप्स्यसे (aiōnios g166) 16 पुनर्दासमिव
लप्स्यसे तन्नाहि किन्तु दासात् श्रेष्ठं मम प्रियं तव य शारीरिकसम्बन्धात्
प्रभुसम्बन्धाच्च ततोऽधिकं प्रियं भ्रातरमिव | 17 अतो हेतो र्यदि मां
सडभागिनं जानासि तर्हि मामिव तमनुगृहाण | 18 तेन यदि तव
किमप्यपराद्धं तुभ्यं किमपि धार्यते वा तर्हि तत् भमेति विदित्वा गाणय |
19 अदं तत् परिशोत्स्यामि, अतत् पौलोऽदं स्वदस्तेन लिखामि, यतस्त्वं
स्वप्राणान् अपि मह्यं धारयसि तद् वक्तुं नेच्छामि | 20 भो भ्रातः,
प्रभोः कृते मम वाञ्छां पूर्य श्रीष्टस्य कृते मम प्राणान् आप्यायय | 21
तवाज्ञाग्राहित्वे विश्वस्य मया अतत् लिप्यते मया यदुच्यते ततोऽधिकं

ત્વયા કારિષ્યત ઇતિ જાનામિ | 22 તત્કરણસમયે મદર્થમપિ વાસગૃહં ત્વયા
સજ્જક્રિયાતાં ચતો યુષ્માકં પ્રાર્થનાનાં ફલરૂપો વર ઇવાહં યુષ્મભ્યં દાયિષ્યે
મમેતિ પ્રત્યાશા જાયતે | 23 ખ્રીષ્ટસ્ય યીશાઃ કૃતે મયા સહ બન્દિરિપાહ્ણા 24
મમ સહકારિણો માર્ક આરિષ્ટાખો દીમા લૂકશ્ચ ત્વાં નમસ્કારં વેદયન્તિ |
25 અસ્માકં પ્રભો ર્યાશુખ્રીષ્ટસ્યાનુગ્રહો યુષ્માકમ્ આત્મના સહ ભૂયાત્ |
આમેન્ |

ઇબ્રિણ:

1 પુરા ય ઈશ્વરો ભવિષ્યદ્વાદિભિઃ પિતૃલોકેભ્યો નાનાસમયે નાનાપ્રકારં કથિતવાન્ 2 સ એતસ્મિન્ શેષકાલે નિજપુત્રેણાસ્મભ્યં કથિતવાન્ | સ તં પુત્રં સર્વ્યાધિકારિણં કૃતવાન્ તેનૈવ ય સર્વજગન્તિ સૃષ્ટવાન્ | (aiōn g165) 3 સ પુત્રસ્તસ્ય પ્રભાવસ્ય પ્રતિભિમ્બસ્તસ્ય તત્ત્વસ્ય મૂર્તિશ્રાસ્તિ સ્વીયશક્તિવાક્યેન સર્વ્ય ધત્તે ય સ્વપ્રાણૈરસ્માકં પાપમાજ્જનં કૃત્વા ઊર્દ્ધ્વસ્થાને મહામહિમ્નો દક્ષિણપાશ્વે સમુપવિષ્ટવાન્ | 4 દિવ્યદૂતગણાઃ યથા સ વિશિષ્ટનામ્નો ડધિકારી જાતસ્તથા તેભ્યોડપિ શ્રેષ્ઠો જાતઃ | 5 યતો દૂતાનાં મધ્યે કદાચિદીશ્વરેણેદં ક ઉક્તઃ? યથા, "મદીયતનયો ડસિ ત્વમ્ અદૈવ જનિતો મયા | " પુનશ્ચ "અહં તસ્ય પિતા ભવિષ્યામિ સ ય મમ પુત્રો ભવિષ્યતિ | " 6 અપરં જગતિ સ્વકીયાદ્વિતીયપુત્રસ્ય પુનરાનયનકાલે તેનોક્તં, યથા, "ઈશ્વરસ્ય સકલૈ દૂતૈરેષ એવ પ્રણમ્યતાં | " 7 દૂતાન્ અધિ તેનેદમ્ ઉક્તં, યથા, "સ કરોતિ નિજાન્ દૂતાન્ ગન્ધવાહસ્વરૂપકાન્ | વહ્નિશિખાસ્વરૂપાંશ્ચ કરોતિ નિજસેવકાન્ | " 8 કિન્તુ પુત્રમુદ્દિશ્ય તેનોક્તં, યથા, "હે ઈશ્વર સદા સ્થાયિ તવ સિંહાસનં ભવેત્ | યાથાર્થસ્ય ભવેદ્દણ્ડો રાજદણ્ડસ્ત્વદીયકઃ | (aiōn g165) 9 પુણ્યે પ્રેમ કરોષિ ત્વં કિન્નાધર્મમ્ ઋતીયસે | તસ્માદ્ ય ઈશ ઈશસ્તે સ તે મિત્રગણાદપિ | અધિકાહ્લાદતૈલેન સેચનં કૃતવાન્ તવ | | " 10 પુનશ્ચ, યથા, "હે પ્રભો પૃથિવીમૂલમ્ આદૌ સંસ્થાપિતં ત્વયા | તથા ત્વદીયહસ્તેન કૃતં ગગનમણ્ડલં | 11 ઇમે વિનંક્ષ્યતસ્ત્વન્તુ નિત્યમેવાવતિષ્ઠસે | ઇદન્તુ સકલં વિશ્વં સંજરિષ્યતિ વસ્ત્રવત્ | 12 સઙ્કોચિતં ત્વયા તત્તુ વસ્ત્રવત્ પરિવત્સ્યતે | ત્વન્તુ નિત્યં સ એવાસી નિરિન્તાસ્તવ વત્સરાઃ | | " 13 અપરં દૂતાનાં મધ્યે કઃ કદાચિદીશ્વરેણેદમુક્તઃ? યથા, "તવારીન્ પાદપીઠં તે યાવન્નહિ કરોમ્યહં | મમ દક્ષિણદિગ્ભાગે તાવત્ ત્વં સમુપાવિશ | | " 14 યે પરિત્રાણસ્યાધિકારિણો ભવિષ્યન્તિ તેષાં પરિચર્યાર્થં પ્રેષ્યમાણાઃ સેવનકારિણ આત્માનઃ કિં તે સર્વ્યે દૂતા નહિ?

2 અતો વયં યદ્ ભ્રમસ્રોતસા નાપનીયામહે તદર્થમસ્માભિ ર્યધદ્ અશ્રાવિ તસ્મિન્ મનાંસિ નિધાતવ્યાનિ | 2 યતો હેતો દૂતૈઃ કથિતં વાક્યં યદમોઘમ્ અભવદ્ યદિ ય તલ્લઙ્ગનકારિણો તસ્યાગ્રાહકાય ય સર્વ્યસ્મૈ સમુચિતં

एऽम् अदीयत्, 3 तर्ह्यस्माभिस्तादृशं मलापरित्राणाम् अवज्ञाय कथं रक्षा
 प्राप्स्यते, यत् प्रथमतः प्रभुना प्रोक्तं ततोऽस्मान् यावत् तस्य श्रोतृभिः
 स्थिरीकृतं, 4 अपरं लक्षाणैरद्भुतकर्म्मभिर्विविधशक्तिप्रकाशेन निजेष्यतः
 पवित्रस्यात्मनो विभागेन य यद् एश्वरेण प्रमाणीकृतम् अबूत्। 5 वयं तु
 यस्य भाविराज्यस्य कथां कथयामः, तत् तेन् द्विव्यदूतानाम् अधिनीकृतमिति
 नहि। 6 किन्तु कुत्रापि कश्चित् प्रमाणम् एदृशं दत्तवान्, यथा, "किं वस्तु
 मानवो यत् स नित्यं संस्मर्यते त्वया। किं वा मानवसन्तानो यत् स
 आलोच्यते त्वया। 7 द्विव्यदूतगणोभ्यः स किञ्चिन् न्यूनः कृतस्त्वया।
 तेजोगौरवत्रुपेण किरीटेन विभूषितः। सृष्टं यत् ते कराभ्यां स तत्रभुत्वे
 नियोजितः। 8 यराणाम् तस्यैव त्वया सर्व्वं वशीकृतं। " तेन सर्व्वं
 यस्य वशीकृतं तस्यावशीभूतं किमपि नावशेषितं किन्त्वधुनापि वयं
 सर्वाणि तस्य वशीभूतानि न पश्यामः। 9 तथापि द्विव्यदूतगणोभ्यो
 यः किञ्चिन् न्यूनिकृतोऽभवत् तं यीशुं मृत्युभोगहेतोस्तेजोगौरवत्रुपेण
 किरीटेन विभूषितं पश्यामः, यत् एश्वरस्यानुग्रहात् स सर्व्वेषां कृते
 मृत्युम् अस्वदत्। 10 अपरञ्च यस्मै येन य कृत्स्नं वस्तु सृष्टं विधत्ते
 बहुसन्तानानां विभवायानयनकाले तेषां परित्राणाग्रसरस्य दुःखभोगेन
 सिद्धीकरणमपि तस्योपयुक्तम् अबवत्। 11 यतः पावकः पूयमानाश्च
 सर्व्वे ओकस्मादेवोत्पन्ना भवन्ति, एति हेतोः स तान् भ्रातृन् वदितुं न
 लज्जते। 12 तेन स उक्तवान्, यथा, "धोतयिष्यामि ते नाम भ्रातृणां
 मध्यतो मम। परन्तु समिते मध्ये करिष्ये ते प्रशंसनं। " 13 पुनरपि, यथा,
 "तस्मिन् विश्वस्य स्थाताहं। " पुनरपि, यथा, "पश्याहम् अपत्यानि य
 द्तानि मह्यम् एश्वरात्। " 14 तेषाम् अपत्यानां रुधिरपललविशिष्टत्वात्
 सोऽपि तद्वत् तद्विशिष्टोऽभूत् तस्याभिप्रायोऽयं यत् स मृत्युबलाधिकारिणं
 शयतानं मृत्युना बलहीनं कुर्यात् 15 ये य मृत्युभयाद् यावज्जिवनं
 दासत्वस्य निधना आसन् तान् उद्धारयेत्। 16 स दूतानाम् उपकारी न
 भवति किन्विब्राहीमो वंशस्यैवोपकारी भवती। 17 अतो हेतोः स यथा
 कृपावान् प्रजाणां पापशोधनार्थम् एश्वरोद्देश्यविषये विश्वास्यो मलायाजको
 भवेत् तदर्थं सर्व्वविषये स्वभ्रातृणां सदृशीभवनं तस्योचितम् आसीत्।

18 यतः स स्वयं परीक्षां गत्वा यं दृग्भोगम् अवगतस्तेन परीक्षाकान्तान्
उपकर्तुं शक्नोति।

3 हे स्वर्गीयस्याह्वानस्य सड्भागिनः पवित्रभ्रातरः, अस्माकं
धर्मप्रतिज्ञाया दूतोऽग्रसरश्च यो यीशुस्तम् आलोचयं। 2 मूसा यद्वत् तस्य
सर्वपरिवारमध्ये विश्वास्य आसीत्, तद्वत् अयमपि स्वनियोजकस्य समीपे
विश्वास्यो भवति। 3 परिवाराय यद्वत् तत्स्थापयितुरधिकं गौरवं भवति
तद्वत् मूससोऽयं भद्रतरगौरवस्य योग्यो भवति। 4 अकैकस्य निवेशनस्य
परिजनानां स्थापयिता कश्चिद् विधते यश्च सर्वस्थापयिता स ईश्वर
अेव। 5 मूसाश्च वक्ष्यमाणानां साक्षी भृत्य एव तस्य सर्वपरिजनमध्ये
विश्वास्योऽभवत् किन्तु श्रीष्टस्तस्य परिजनानामध्यक्ष एव। 6 वयं
तु यदि विश्वासस्योत्साहं श्लाघनञ्च शेषं यावद् धारयामस्तर्हि तस्य
परिजना भवामः। 7 अतो हेतोः पवित्रेषात्मना यद्वत् कथितं, तद्वत्,
"अध यूयं कथां तस्य यदि संश्रोतुमिच्छथ। 8 तर्हि पुरा परीक्षाया दिने
प्रान्तरमध्यतः। मदाज्ञानिग्रहस्थाने युष्माभिस्तु कृतं यथा। तथा मा
कुरुतेदानीं कठिनानि मनांसि वः। 9 युष्माकं पितरस्तत्र मत्परीक्षाम्
अकुर्वत। कुर्वद्भिर्मेऽनुसन्धानं तैरदृश्यन्त मत्क्रियाः। यत्वारिंशत्समा
यावत् कुट्ट्वाहन्तु तदनवये। 10 अवादिषम् एभे लोका भ्रान्तान्तःकरणाः
सदा। मामकीनानि वर्तमानि परिजानन्ति नो एभे। 11 एति हेतोरहं कोपात्
शपथं कृतवान् एभं। प्रेवेक्ष्यते जनैरेतैर्न विश्रामस्थलं मम। | " 12 हे
भ्रातरः सावधाना भवत, अमरेश्वरात् निवर्त्तको योऽविश्वासस्तधुक्तं
दृष्टान्तःकरणं युष्माकं कस्यापि न भवतु। 13 किन्तु यावद् अधनामा समयो
विधते तावद् युष्मन्मध्ये कोऽपि पापस्य वञ्चनया यत् कठोरीकृतो न भवेत्
तदर्थं प्रतिदिनं परस्परम् उपदिशत। 14 यतो वयं श्रीष्टस्यांशिनो जाताः
किन्तु प्रथमविश्वासस्य दृढत्वम् अस्माभिः शेषं यावद् अमोघं धारयितव्यं।
15 अध यूयं कथां तस्य यदि संश्रोतुमिच्छथ, तर्ह्याज्ञालङ्घनस्थाने युष्माभिस्तु
कृतं यथा, तथा मा कुरुतेदानीं कठिनानि मनांसि व एति तेन यदुक्तं, 16
तदनुसाराद् ये श्रुत्वा तस्य कथां न गृहीतवन्तस्ते के? किं मूससा मिसरदेशाद्
आगताः सर्वे लोका नहि? 17 केभ्यो वा स यत्वारिंशद्वर्षाणि यावद्
अकुड्यत्? पापं कुर्वतां येषां कुलापाः प्रान्तरेऽपतन् किं तेभ्यो नहि? 18

પ્રવેક્ષ્યતે જનૈરેતૈ ન વિશ્રામસ્થલં મમેતિ શપથઃ કેષાં વિરુદ્ધં તેનાકારિ? કિમ્ અવિશ્વાસિનાં વિરુદ્ધં નહિ? 19 અતસ્તે તત્ સ્થાનં પ્રવેષ્ટુમ્ અવિશ્વાસાત્ નાશક્રુવન્ ઇતિ વયં વીક્ષામહે |

4 અપરં તદ્વિશ્રામપ્રાપ્તેઃ પ્રતિજ્ઞા યદિ તિષ્ઠતિ તર્હાસ્માકં કશ્ચિત્ ચેત્ તસ્યાઃ ક્ષ્ણેન વચ્ચિતો ભવેત્ વયમ્ એતસ્માદ્ બિભીમઃ | 2 યતો ડસ્માકં સમીપે યદ્વત્ તદ્વત્ તેષાં સમીપેડપિ સુસંવાદઃ પ્રચારિતો ડભવત્ કિન્તુ તૈઃ શ્રુતં વાક્યં તાન્ પ્રતિ નિષ્કલમ્ અભવત્, યતસ્તે શ્રોતારો વિશ્વાસેન સાદ્ધ્વં તન્નામિશ્રયન્ | 3 તદ્ વિશ્રામસ્થાનં વિશ્વાસિભિરસ્માભિઃ પ્રવિશ્યતે યતસ્તેનોક્તં, "અહં કોપાત્ શપથં કૃતવાન્ ઇમં, પ્રવેક્ષ્યતે જનૈરેતૈ ન વિશ્રામસ્થલં મમ | " કિન્તુ તસ્ય કર્માણિ જગતઃ સૃષ્ટિકાલાત્ સમાપ્તાનિ સન્તિ | 4 યતઃ કસ્મિંશ્ચિત્ સ્થાને સપ્તમં દિનમધિ તેનેદમ્ ઉક્તં, યથા, "ઈશ્વરઃ સપ્તમે દિને સ્વકૃતેભ્યઃ સર્વકર્મભ્યો વિશશ્રામ | " 5 કિન્ત્વેતસ્મિન્ સ્થાને પુનસ્તેનોચ્યતે, યથા, "પ્રવેક્ષ્યતે જનૈરેતૈ ન વિશ્રામસ્થલં મમ | " 6 ક્ષલતસ્તત્ સ્થાનં કૈશ્ચિત્ પ્રવેષ્ટવ્યં કિન્તુ યે પુરા સુસંવાદં શ્રુતવન્તસ્તૈરવિશ્વાસાત્ તન્ન પ્રવિષ્ટમ્, 7 ઇતિ હેતોઃ સ પુનરધનામકં દિનં નિરૂપ્ય દીર્ઘકાલે ગતેડપિ પૂર્વોક્તાં વાયં દાયૂદા કથયતિ, યથા, "અધ યૂયં કથાં તસ્ય યદિ સંશ્રોતુમિચ્છથ, તર્હિ મા કુરુતેદાનીં કઠિનાનિ મનાંસિ વઃ | " 8 અપરં ચિહોશૂયો યદિ તાન્ વ્યશ્રામયિષ્યત્ તર્હિ તતઃ પરમ્ અપરસ્ય દિનસ્ય વાગ્ ઈશ્વરેણ નાકથયિષ્યત | 9 અત ઈશ્વરસ્ય પ્રજાભિઃ કર્તવ્ય એકો વિશ્રામસ્તિષ્ઠતિ | 10 અપરમ્ ઈશ્વરો યદ્વત્ સ્વકૃતકર્મભ્યો વિશશ્રામ તદ્વત્ તસ્ય વિશ્રામસ્થાનં પ્રવિષ્ટો જનોડપિ સ્વકૃતકર્મભ્યો વિશ્રામ્યતિ | 11 અતો વયં તદ્ વિશ્રામસ્થાનં પ્રવેષ્ટું યતામહે, તદવિશ્વાસોદાહરણેન કોડપિ ન પતતુ | 12 ઈશ્વરસ્ય વાદોડમરઃ પ્રભાવવિશિષ્ટશ્ચ સર્વસ્માદ્ દ્વિધારખજ્જાદપિ તીક્ષ્ણઃ, અપરં પ્રાણાત્મનો ગ્રંથિમજ્જયોશ્ચ પરિભેદાય વિરચ્છેદકારી મનસશ્ચ સક્રુલ્યાનામ્ અભિપ્રેતાનાઞ્ચ વિચારકઃ | 13 અપરં યસ્ય સમીપે સ્વીયા સ્વીયા કથાસ્માભિઃ કથયિતવ્યા તસ્યાગોચરઃ કોડપિ પ્રાણી નાસ્તિ તસ્ય દૃષ્ટૌ સર્વમેવાનાવૃતં પ્રકાશિતઞ્ચાસ્તે | 14 અપરં ય ઉચ્યતમં સ્વર્ગં પ્રવિષ્ટ એતાદૃશ એકો વ્યક્તિરર્થત ઈશ્વરસ્ય પુત્રો યીશુરસ્માકં મહાયાજકોડસ્તિ, અતો હેતો વયં ધર્મપ્રતિજ્ઞાં દૃઢમ્

आलम्बामहै | 15 अस्माकं यो महायाजको ऽस्ति सोऽस्माकं दुःभैः दुःभितो
 भवितुम् अशक्तो नहि किन्तु पापं विना सर्वविषये वयमिव परीक्षितः |
 16 अतमेव कृपां ग्रहीतुं प्रयोजनीयोपकारार्थम् अनुग्रहं प्राप्तुञ्च वयम्
 उत्साहेनानुग्रहसिंहासनस्य समीपं यामः |

5 यः कश्चित् महायाजको भवति स मानवानां मध्यात् नीतः सन् मानवानां
 कृतं एश्वरोद्देश्यविषयेऽर्धत उपहाराणां पापार्थक्यबलीनाञ्च दानं नियुज्यते |
 2 स याज्ञानां भ्रान्तानाञ्च लोकानां दुःभेन दुःभी भवितुं शक्नोति, यतो हेतोः
 स स्वयमपि दौर्बल्यवेष्टितो भवति | 3 अतस्मात् कारणाख्यं यद्वत् लोकानां
 कृते तद्वद् आत्मकृतेऽपि पापार्थक्यबलिदानं तेन कर्तव्यं | 4 स धोऽप्यपदः
 स्वेच्छातः केनापि न गृह्यते किन्तु हारोऽपि एव य एश्वरेणाऽभूयते तेनैव
 गृह्यते | 5 अवेवम्कारेण श्रीष्टोऽपि महायाजकत्वं ग्रहीतुं स्वीयगौरवं स्वयं
 न कृतवान्, किन्तु "मदीयतनयोऽसि त्वम् अधैव जनितो मयेति" वाचं यस्तं
 भाषितवान् स अवे तस्य गौरवं कृतवान् | 6 तद्वद् अन्यगीतेऽपीदमुक्तं,
 त्वं मल्कीषेदकः श्रोण्यां याजकोऽसि सदातनः | (aiṅ 9165) 7 स य
 देहवासकाले बहुकन्देनाश्रुपातेन य मृत्युत उद्भवेऽस्य समर्थस्य पितुः समीपे
 पुनः पुनर्विनतिं प्रथनाञ्च कृत्वा तद्वत्पुत्रिणीं शङ्कतो रक्षां प्राप्य य 8
 यद्यपि पुत्रोऽभवत् तथापि यैरक्लिश्यत तैराज्ञाग्रहणम् अशिक्षत | 9 एतं
 सिद्धीभूय निजाज्ञाग्राहिकां सर्वेषाम् अनन्तपरित्राणस्य कारणास्वप्नो
 ऽभवत् | (aiṅnios 9166) 10 तस्मात् स मल्कीषेदकः श्रेणीभुक्तो महायाजक
 एश्वरेणाभ्यातः | 11 तमध्यस्माकं बहुकथाः कथयितव्याः किन्तु ताः
 स्तब्धकर्णै र्युष्माभिर्दुर्गम्याः | 12 यतो यूयं यद्यपि समयस्य दीर्घत्वात्
 शिक्षका भवितुम् अशक्यत तथापीश्वरस्य वाक्यानां या प्रथमा वार्णमाला
 तामधि शिक्षाप्राप्ति र्युष्माकं पुनरावश्यका भवति, तथा कठिनद्रव्ये नहि किन्तु
 दुग्धे युष्माकं प्रयोजनम् आस्ते | 13 यो दुग्धपायी स शिशुरेवेतिकारणात्
 धर्मवाक्ये तत्परो नास्ति | 14 किन्तु सदसद्वियारे येषां येतांसि व्यवहारेण
 शिक्षितानि तादृशानां सिद्धलोकानां कठोरद्रव्येषु प्रयोजनमस्ति |

6 वयं मृतिजनककर्मण्यो मनःपरावर्तनम् एश्वरे विश्वासो मञ्जनशिक्षां
 ऽस्तार्पाणं मृतलोकानाम् उत्थानम् 2 अनन्तकालस्थायिवियाराज्ञा यैतैः
 पुनर्भित्तिमूलं न स्थापयन्तः श्रीष्टविषयकं प्रथमोपदेशं पश्चात्कृत्य सिद्धि

યાવદ્ અગ્રસરા ભવામ | (aiōnios g166) 3 ઈશ્વરસ્યાનુમત્યા ચ તદ્
 અસ્માભિઃ કારિષ્યતે | 4 ચ એકકૃત્વો દીપ્તિમયા ભૂત્વા સ્વર્ગીયવરસમ્
 આસ્વદિતવન્તઃ પવિત્રસ્યાત્મનોડંશિનો જાતા 5 ઈશ્વરસ્ય સુવાક્યં
 ભાવિકાલસ્ય શક્તિઆસ્વદિતવન્તશ્ચ તે ભ્રષ્ટ્વા યદિ (aiōn g165) 6
 સ્વમનોભિરીશ્વરસ્ય પુત્રં પુનઃ કુશે ધ્વન્તિ લજ્જાસ્પદં કુર્વ્યતે ચ તર્હિ
 મનઃપરાવર્તનાય પુનસ્તાન્ નવીનીકર્તુ કોડપિ ન શક્નોતિ | 7 યતો યા
 ભૂમિઃ સ્વોપરિ ભૂયઃ પતિતં વૃષ્ટિં પિવતી તત્કલાધિકારિણાં નિમિત્તમ્
 ઇષ્ટાનિ શાકાદીન્યુત્પાદયતિ સા ઈશ્વરાદ્ આશિષં પ્રાપ્તા | 8 કિન્તુ યા
 ભૂમિ ગોક્ષુરકણ્ટકવૃક્ષાન્ ઉત્પાદયતિ સા ન ગ્રાહ્યા શાપાર્હા ચ શેષે
 તસ્યા દાહો ભવિષ્યતિ | 9 હે પ્રિયતમાઃ, યદપિ વયમ્ એતાદૃશં વાક્યં
 ભાષામહે તથાપિ યૂયં તત ઉત્કૃષ્ટાઃ પરિત્રાણપથસ્ય પથિકાશ્રાધ્વ ઇતિ
 વિશ્વસામઃ | 10 યતો યુષ્માભિઃ પવિત્રલોકાનાં ચ ઉપકારો ડકારિ ક્રિયતે
 ચ તેનેશ્વરસ્ય નામ્ને પ્રકાશિતં પ્રેમ શ્રમઞ્ચ વિસ્મર્તુમ્ ઈશ્વરોડન્યાયકારી
 ન ભવતિ | 11 અપરં યુષ્માકમ્ એકૈકો જનો યત્ પ્રત્યાશાપૂરણાર્થ શેષં
 યાવત્ તમેવ યત્નં પ્રકાશયેદિત્યહમ્ ઇચ્છામિ | 12 અતઃ શિથિલા ન
 ભવત કિન્તુ યે વિશ્વાસેન સહિષ્ણુતયા ચ પ્રતિજ્ઞાનાં ફલાધિકારિણો
 જાતાસ્તેષામ્ અનુગામિનો ભવત | 13 ઈશ્વરો યદા ઇબ્રાહીમે પ્રત્યજાનાત્
 તદા શ્રેષ્ઠસ્ય કસ્યાપ્યપરસ્ય નામ્ના શપથં કર્તુ નાશક્નોત્, અતો હેતોઃ
 સ્વનામ્ના શપથં કૃત્વા તેનોક્તં યથા, 14 "સત્યમ્ અહં ત્વામ્ આશિષં
 ગદ્ધિષ્યામિ તવાન્વયં વર્દ્ધયિષ્યામિ ચ | " 15 અનેન પ્રકારેણ સ સહિષ્ણુતાં
 વિધાય તસ્યાઃ પ્રત્યાશાયાઃ ફલં લબ્ધવાન્ | 16 અથ માનવાઃ શ્રેષ્ઠસ્ય
 કસ્યચિત્ નામ્ના શપન્તે, શપથશ્ચ પ્રમાણાર્થ તેષાં સર્વવિવાદાન્તકો
 ભવતિ | 17 ઇત્યસ્મિન્ ઈશ્વરઃ પ્રતિજ્ઞાયાઃ ફલાધિકારિણઃ સ્વીયમન્ત્રણાયા
 અમોઘતાં બાહુલ્યતો દર્શયિતુમિચ્છન્ શપથેન સ્વપ્રતિજ્ઞાં સ્થિરીકૃતવાન્ |
 18 અતએવ યસ્મિન્ અનૃતકથનમ્ ઈશ્વરસ્ય ન સાધ્યં તાદૃશેનાયલેન
 વિષયદ્વયેન સમ્મુખસ્થરક્ષાસ્થલસ્ય પ્રાપ્તયે પલાયિતાનામ્ અસ્માકં સુદૃઢા
 સાન્ત્વના જાયતે | 19 સા પ્રત્યાશાસ્માકં મનોનૌકાયા અચલો લજ્જરો ભૂત્વા
 વિચ્છેદકવસ્ત્રસ્યાભ્યન્તરં પ્રવિષ્ટા | 20 તત્રૈવાસ્માકમ્ અગ્રસરો યીશુઃ
 પ્રવિશ્ય મલ્કીષેદકઃ શ્રેણ્યાં નિત્યસ્થાયી યાજકોડભવત્ | (aiōn g165)

7 शालमस्य राजा सर्वोपरिस्थस्येश्वरस्य याजकश्च सन् यो नृपतीनां
 माराणात् प्रत्यागतम् एब्राहीमं साक्षात्कृत्याशिषं गदितवान्, 2 यस्मै
 येब्राहीमं सर्वद्रव्याणां दशमांशं दत्तवान् स मल्कीषेदङ् स्वनाम्नोऽर्थेन
 प्रथमतो धर्म्मराजः पश्चात् शालमस्य राजार्थतः शान्तिराजो भवति।
 3 अपरं तस्य पिता माता वंशस्य निर्णय आयुष आरम्भो ज्वनस्य
 शेषश्रौतेषाम् अभावो भवति, एत्थं स एश्वरपुत्रस्य सदृशीकृतः, स
 त्वनन्तकालं यावद् याजकस्तिष्ठति। 4 अतएवास्माकं पूर्वपुरुष एब्राहीमं
 यस्मै लुठितद्रव्याणां दशमांशं दत्तवान् स कीदृक् मदान् तद् आलोचयत। 5
 याजकत्वप्राप्ता लेवेः सन्ताना व्यवस्थानुसारेण लोकेभ्योऽर्थत एब्राहीमो
 जातेभ्यः स्वीयभ्रातृभ्यो दशमांशग्रहणस्यादेशं लब्धवन्तः। 6 किन्त्वसौ
 यद्यपि तेषां वंशात् नोत्पन्नस्तथापीब्राहीमो दशमांशं गृहीतवान् प्रतिज्ञानाम्
 अधिकारिणम् आशिषं गदितवांश्च। 7 अपरं यः श्रेयान् स क्षुद्रतरायाशिषं
 ददातीत्यत्र कोऽपि सन्देहो नास्ति। 8 अपरम् एदानीं ये दशमांशं गृह्णन्ति ते
 भृत्योरधीना मानवाः किन्तु तदानीं यो गृहीतवान् स ज्वतीतिप्रमाणप्राप्तः।
 9 अपरं दशमांशग्राही लेविशपीब्राहीमद्वारा दशमांशं दत्तवान् अतदपि
 कथयितुं शक्यते। 10 यतो यदा मल्कीषेदङ् तस्य पितरं साक्षात् कृतवान्
 तदानीं स लेविः पितुरुत्स्यासीत्। 11 अपरं यस्य सम्बन्धे लोका
 व्यवस्थां लब्धवन्तस्तेन लेवीययाजकवर्गेषु यद्वि सिद्धिः समभविष्यत्
 तर्हि हारोणस्य श्रेण्या मध्याद् याजकं न निरूप्येश्वरेण मल्कीषेदङ् श्रेण्या
 मध्याद् अपरस्यैकस्य याजकस्योत्थापनं कुत आवश्यकम् अभविष्यत्? 12
 यतो याजकवर्गस्य विनिमयेन सुतरां व्यवस्थाया अपि विनिमयो जायते।
 13 अपरञ्च तद् वाक्यं यस्योद्देश्यं सोऽपरेण वंशेन संयुक्ताऽस्ति तस्य
 वंशस्य य कोऽपि कदापि वेधाः कर्म्म न कृतवान्। 14 वस्तुतस्तु यं वंशमधि
 भूसा याजकत्वस्यैकां कथामपि न कथितवान् तस्मिन् यिदूदावंशेऽस्माकं प्रभु
 र्जन्म गृहीतवान् एति सुस्यष्टं। 15 तस्य स्पष्टतरम् अपरं प्रमाणमिदं यत्
 मल्कीषेदङ् सादृश्यवतापरेण तादृशेन याजकेनोद्देतव्यं, 16 यस्य निरूपणं
 शरीरसम्बन्धीयविधियुक्तया व्यवस्थाया न भवति किन्त्वक्षयज्वनयुक्तया
 शक्त्या भवति। 17 यत एश्वर एदं साक्ष्यं दत्तवान्, यथा, "त्वं मल्कीषेदङ्
 श्रेण्यां याजकोऽसि सदातनः।" (aiōn g165) 18 अनेनाग्रवर्तिनो

विधे दृढत्वताया निष्कलतायाश्च हेतोरर्थतो व्यवस्थया किमपि सिद्धं
न जातमितिहेतोस्तस्य लोपो भवति। 19 यथा य वयम् एश्वरस्य
निकटवर्तिनो भवाम अतादृशी श्रेष्ठप्रत्याशा संस्थाप्यते। 20 अपरं यीशुः
शपथं विना न नियुक्तस्तस्मादपि स श्रेष्ठनियमस्य मध्यस्थो जातः।
21 यतस्ते शपथं विना याजका जाताः किन्त्वसौ शपथेन जातः यतः
स एदमुक्तः, यथा, 22 "परमेश एदं शोपे न य तस्मान्निवत्स्यते।
त्वं मल्कीषेदकः श्रेण्यां याजकोऽसि सदातनः।" (aiōn g165) 23 ते य
बलवो याजका अभवन् यतस्ते मृत्युना नित्यस्थायित्वात् निवारिताः, 24
किन्त्वसावनन्तकालं यावत् तिष्ठति तस्मात् तस्य याजकत्वं न परिवर्तनीयं।
(aiōn g165) 25 ततो हेतो र्ये मानवास्तेनेश्वरस्य सन्निधिं गच्छन्ति तान्
स शेषं यावत् परित्रातुं शक्नोति यतस्तेषां कृते प्रार्थनां कर्तुं स सततं
श्रुवति। 26 अपरम् अस्माकं तादृशमलायाजकस्य प्रयोजनमासीद् यः
पवित्रो ऽर्हिसको निष्कलङ्कः पापित्यो भिन्नः स्वर्गाद्युच्यीकृतश्च स्यात्।
27 अपरं मलायाजकानां यथा तथा तस्य प्रतिदिनं प्रथमं स्वपापानां कृते ततः
परं लोकानां पापानां कृते बलिदानस्य प्रयोजनं नास्ति यत आत्मबलिदानं
कृत्वा तद् अेककृत्यस्तेन सम्पादितं। 28 यतो व्यवस्थया ये मलायाजका
निर्गच्छन्ते ते दौर्बल्ययुक्ता मानवाः किन्तु व्यवस्थातः परं शपथयुक्तेन
वाक्येन यो मलायाजको निर्गमितः सो ऽनन्तकालार्थं सिद्धः पुत्र अेव। (aiōn
g165)

8 कथ्यमानानां वाक्यानां सारोऽयम् अस्माकम् अतादृश अेको
मलायाजकोऽस्ति यः स्वर्गे मलामलिम्नः सिंहासनस्य दक्षिणपार्श्वो
समुपविष्टवान् 2 यश्च दृष्यं न मनुजैः किन्त्वीश्वरोऽसि स्थापितं तस्य
सत्यदृष्यस्य पवित्रवस्तूनाञ्च सेवकः स भवति। 3 यत अेकेको मलायाजको
नैवेधानां बलीनाञ्च दाने नियुज्यते, अतो हेतोरेतस्यापि किञ्चिद् उत्सर्जनीयं
विधत् एत्यावश्यकं। 4 किञ्च स यद्वि पृथिव्याम् अस्थास्यत् तर्हि याजको
नाभविष्यत्, यतो ये व्यवस्थानुसारात् नैवेधानि ददत्येतादृशा याजका
विधन्ते। 5 ते तु स्वर्गीयवस्तूनां दृष्टान्तेन छायया य सेवामनुतिष्ठन्ति यतो
भूससि दृष्यं साधयितुम् उधते सतीश्वरस्तदेव तमादिष्टवान् इलतः स
तमुक्तवान्, यथा, "अवधेहि गिरौ त्वां यधन्निदर्शनं दर्शितं तद्दत् सव्याशि

त्वया क्रियन्तां। " 6 किन्त्विदानीम् असौ तस्मात् श्रेष्ठं सेवकपदं प्राप्तवान्
यतः स श्रेष्ठप्रतिज्ञाभिः स्थापितस्य श्रेष्ठनियमस्य मध्यस्थोऽभवत्।
7 स प्रथमो नियमो यदि निर्दोषोऽभविष्यत् तर्हि द्वितीयस्य नियमस्य
किमपि प्रयोजनं नाभविष्यत्। 8 किन्तु स दोषमारोपयन् तेभ्यः कथयति,
यथा, "परमेश्वर एतं भाषते पश्य यस्मिन् समयेऽहम् एसायेलवंशेन
यिहुदावंशेन य साद्धर्मं अकं नवीनं नियमं स्थिरीकरिष्याम्येतादृशः समय
आयाति। 9 परमेश्वरोऽपरमपि कथयति तेषां पूर्वपुरुषाणां भिसरदेशाद्
आनयनार्थं यस्मिन् दिनेऽहं तेषां करं धृत्वा तैः सह नियमं स्थिरीकृतवान्
तद्दिनस्य नियमानुसारेण नहि यतस्तैर्मम नियमे लङ्घितेऽहं तान् प्रति यिन्तां
नाकरवं। 10 किन्तु परमेश्वरः कथयति तद्दिनात् परमहं एसायेलवंशीयैः
साद्धर्मं एतं नियमं स्थिरीकरिष्यामि, तेषां यित्ते मम विधीन् स्थापयिष्यामि
तेषां हृत्पत्रे य तान् लेभिष्यामि, अपरमहं तेषाम् एश्वरो भविष्यामि
ते य मम लोका भविष्यन्ति। 11 अपरं त्वं परमेश्वरं जानीहीतिवाक्येन
तेषामेकैको जनः स्वं स्वं समीपवासिनं ब्रातरञ्च पुनर्न शिक्षयिष्यति यत
आक्षुद्रात् महान्तं यावत् सर्व्ये मां ज्ञास्यन्ति। 12 यतो हेतोरहं तेषाम्
अधर्मान् क्षमिष्ये तेषां पापान्यपराधांश्च पुनः कदापि न स्मरिष्यामि। "

13 अनेन तं नियमं नूतनं गदित्वा स प्रथमं नियमं पुरातनीकृतवान्; यस्य
पुरातनं शोर्णाञ्च जातं तस्य लोपो निकटोऽभवत्।

9 स प्रथमो नियम आराधनाया विविधरीतिभिरेहिकपवित्रस्थानेन य
विशिष्ट आसीत्। 2 यतो दूष्यमेकं निरभीयत तस्य प्रथमकोष्ठस्य
नाम पवित्रस्थानमित्यासीत् तत्र दीपवृक्षो भोजनासनं दर्शनीयपूपानां
श्रेणी यासीत्। 3 तत्पश्चाद् द्वितीयायास्तिरष्करिण्या अब्यन्तरे
ऽतिपवित्रस्थानमितिनामकं कोष्ठमासीत्, 4 तत्र य सुवर्णमयो धूपाधारः
परितः सुवर्णमण्डिता नियममञ्जूषा यासीत् तन्मध्ये मान्नायाः सुवर्णघटो
हारोणस्य मञ्जरितदण्डस्तक्षितौ नियमप्रस्तरौ, 5 तद्दुपरि य करुणासने
छायाकारिणौ तेजोमयौ किञ्चिद्वास्ताम्, अतेषां विशेषवृत्तान्तकथनाय
नायं समयः। 6 अतेष्वीदृक् निर्मितेषु याजका एश्वरसेवाम् अनुतिष्ठन्तो
दूष्यस्य प्रथमकोष्ठं नित्यं प्रविशन्ति। 7 किन्तु द्वितीयं कोष्ठं प्रतिवर्षम्
अेककृत्व अेकाकिना महायाजकेन प्रविश्यते किन्वात्मनिमित्तं लोकानाम्

अज्ञानकृतपापानाञ्च निमित्तम् उत्सर्जनीयं रुधिरम् अनादाय तेन न प्रविश्यते। 8 एतन्नेन पवित्र आत्मा यत् ज्ञापयति तद्विदं तत् प्रथमं दृष्ट्यं यावत् तिष्ठति तावत् मलापवित्रस्थानगामी पन्था अप्रकाशितस्तिष्ठति। 9 तस्य दृष्ट्यं वर्तमानसमयस्य दृष्टान्तः, यतो हेतोः साम्प्रतं संशोधनकालं यावद् यन्निर्गमितं तदनुसारात् सेवाकारिणो मानसिकसिद्धिकरणोऽसमर्थाभिः 10 केवलं भाषयेषु विविधभोजनेषु य शारीरिकरीतिभि र्युक्तानि नैवेधानि बलिदानानि य भवन्ति। 11 अपरं भाविमङ्गलानां मलायाजकः श्रीष्ट उपस्थायाडस्तनिर्मितेनार्थत अतत्सृष्टे र्बहिर्भूतेन श्रेष्ठेन सिद्धेन य दृष्ट्येण गत्वा 12 छागानां गोवत्सानां वा रुधिरम् अनादाय स्वीयरुधिरम् आदायैककृत्व अत्र मलापवित्रस्थानं प्रविश्यानन्तकालिकां मुक्तिं प्राप्तवान्। (aiōnios g166) 13 वृषछागानां रुधिरेश्च गवीभस्मनः प्रक्षेपेश्च य यधशुचिलोकाः शारीरिशुचित्वाय पूयन्ते, 14 तर्हि किं मन्यध्वे यः सदातनेनात्मना निष्कलङ्कबलिमिव स्वमेवेश्वराय दत्तवान्, तस्य श्रीष्टस्य रुधिरेश्च युष्माकं मनांस्यमरेश्वरस्य सेवार्यै किं मृत्युजनकेभ्यः कर्मभ्यो न पवित्रीकारिष्यन्ते? (aiōnios g166) 15 स नूतननियमस्य मध्यस्थोऽभवत् तस्याभिप्रायोऽयं यत् प्रथमनियमलङ्घनरूपपापेभ्यो मृत्युना मुक्तौ जातायाम् आडूतलोका अनन्तकालीयसम्पदः प्रतिज्ञाङ्गलं लभेरन्। (aiōnios g166) 16 यत्र नियमो भवति तत्र नियमसाधकस्य बले र्भृत्युना भवितव्यं। 17 यतो हतेन बलिना नियमः स्थिरीभवति किन्तु नियमसाधको बलि र्यावत् श्रुवति तावत् नियमो निरर्थकस्तिष्ठति। 18 तस्मात् स पूर्वनियमोऽपि रुधिरपातं विना न साधितः। 19 इतः सर्वलोकान् प्रति व्यवस्थानुसारेण सर्वा आज्ञाः कथयित्वा भूसा जलेन सिन्दूरवर्णलोम्ना अेषोवतृणेन य सार्द्धं गोवत्सानां छागानाञ्च रुधिरं गृहीत्वा ग्रन्थे सर्वलोकेषु य प्रक्षिप्य बलाघे, 20 युष्मान् अधीश्वरो यं नियमं निर्गमितवान् तस्य रुधिरमेतत्। 21 तद्वत् स दृष्ट्येऽपि सेवार्थकेषु सर्वपात्रेषु य रुधिरं प्रक्षिप्तवान्। 22 अपरं व्यवस्थानुसारेण प्रायशः सर्वाणि रुधिरेश्च परिष्कियन्ते रुधिरपातं विना पापमोचनं न भवति य। 23 अपरं यानि स्वर्गीयवस्तूनां दृष्टान्तास्तेषाम् अतैः पावनम् आवश्यकम् आसीत् किन्तु साक्षात् स्वर्गीयवस्तूनाम् अतेभ्यः श्रेष्ठे र्बलिदानैः पावनमावश्यकं। 24 यतः श्रीष्टः सत्यपवित्रस्थानस्य

દૃષ્ટાન્તરૂપં હસ્તકૃતં પવિત્રસ્થાનં ન પ્રવિષ્ટવાન્ કિન્તવસ્મન્નિમિત્તમ્ ઇદાનીમ્
 ઈશ્વરસ્ય સાક્ષાદ્ ઉપસ્થાતું સ્વર્ગમેવ પ્રવિષ્ટઃ | 25 યથા ચ મહાયાજકઃ
 પ્રતિવર્ષં પરશોણિતમાદાય મહાપવિત્રસ્થાનં પ્રવિશતિ તથા ખ્રીષ્ટેન પુનઃ
 પુનરાત્મોત્સર્ગો ન કર્તવ્યઃ, 26 કર્તવ્યે સતિ જગતઃ સૃષ્ટિકાલમારભ્ય
 બહુવારં તસ્ય મૃત્યુભોગ આવશ્યકોડભવત્ઃ કિન્તિવદાનીં સ આત્મોત્સર્ગેણ
 પાપનાશાર્થમ્ એકકૃત્વો જગતઃ શેષકાલે પ્રચકાશે | (aiōn g165) 27 અપરં
 યથા માનુષસ્યૈકકૃત્વો મરણં તત્ પશ્યાદ્ વિચારો નિરૂપિતોડસ્તિ, 28
 તદ્વત્ ખ્રીષ્ટોડપિ બહૂનાં પાપવહનાર્થં બલિરૂપેણૈકકૃત્વ ઉત્સસૃજે, અપરં
 દ્વિતીયવારં પાપાદ્ ભિન્નઃ સન્ યે તં પ્રતીક્ષન્તે તેષાં પરિત્રાણાર્થં દર્શનં
 દાસ્યતિ |

10 વ્યવસ્થા ભવિષ્યન્મજ્જલાનાં છાયાસ્વરૂપા ન ચ વસ્તૂનાં મૂર્તિસ્વરૂપા
 તતો હેતો નિર્ત્યં દીયમાનેરેકવિધૈ વાર્ષિકબલિભિઃ શરણાગતલોકાન્ સિદ્ધાન્
 કર્તુ ક્કદાપિ ન શક્નોતિ | 2 યદશક્ષ્યત્ તર્હિ તેષાં બલીનાં દાનં કિં
 ન ન્યવર્તિષ્યત? યતઃ સેવાકારિષ્વેકકૃત્વઃ પવિત્રીભૂતેષુ તેષાં કોડપિ
 પાપબોધઃ પુન નાભવિષ્યત્ | 3 કિન્તુ તૈર્ બલિદાનૈઃ પ્રતિવત્સરં પાપાનાં
 સ્મારણં જાયતે | 4 યતો વૃષાણાં છાગાનાં વા રુધિરેણ પાપમોચનં ન
 સમ્ભવતિ | 5 એતત્કારણાત્ ખ્રીષ્ટેન જગત્ પ્રવિષ્યેદમ્ ઉચ્યતે, યથા,
 "નેષ્ઢ્વા બલિં ન નૈવેદં દેહો મે નિર્મિતસ્ત્વયા | 6 ન ચ ત્વં બલિભિ
 ર્હવ્યૈઃ પાપઘ્નૈર્ વા પ્રતુષ્યસિ | 7 અવાદિષં તદૈવાહં પશ્ય કુર્વ્યે સમાગમં |
 ધર્મગ્રન્થસ્ય સર્ગે મે વિદ્યતે લિખિતા કથા | ઈશ મનોડભિલાષસ્તે મયા
 સમ્પૂરયિષ્યતે | " 8 ઇત્યસ્મિન્ પ્રથમતો યેષાં દાનં વ્યવસ્થાનુસારાદ્
 ભવતિ તાન્યધિ તેનેદમુક્તં યથા, બલિનૈવેદહવ્યાનિ પાપઘનત્રોપચારકં,
 નેમાનિ વાગ્છસિ ત્વં હિ ન ચૈતેષુ પ્રતુષ્યસીતિ | 9 તતઃ પરં તેનોક્તં
 યથા, "પશ્ય મનોડભિલાષં તે કર્તુ કુર્વ્યે સમાગમં;" દ્વિતીયમ્ એતદ્
 વાક્યં સ્થિરીકર્તુ સ પ્રથમં લુમ્પતિ | 10 તેન મનોડભિલાષેણ ચ વયં
 યીશુખ્રીષ્ટસ્યૈકકૃત્વઃ સ્વશરીરોત્સર્ગાત્ પવિત્રીકૃતા અભવામ | 11 અપરમ્
 એકેકો યાજકઃ પ્રતિદિનમ્ ઉપાસનાં કુર્વન્ ચૈશ્ચ પાપાનિ નાશયિતું ક્કદાપિ
 ન શક્યન્તે તાદૃશાન્ એકરૂપાન્ બલીન્ પુનઃ પુનરુત્સૃજન્ તિષ્ઠતિ | 12
 કિન્તવસૌ પાપનાશકમ્ એકં બલિં દત્વાનન્તકાલાર્થમ્ ઈશ્વરસ્ય દક્ષિણ

ઉપવિશ્ય 13 યાવત્ તસ્ય શત્રવસ્તસ્ય પાદપીઠં ન ભવન્તિ તાવત્
 પ્રતીક્ષમાણસ્તિષ્ઠતિ | 14 યત એકેન બલિદાનેન સોડનન્તકાલાર્થં પૂયમાનાન્
 લોકાન્ સાધિતવાન્ | 15 એતસ્મિન્ પવિત્ર આત્માપ્યસ્માકં પક્ષે પ્રમાણયતિ
 16 "યતો હેતોસ્તદિનાત્ પરમ્ અહં તૈઃ સાદ્ધમ્ ઇમં નિયમં સ્થિરીકરિષ્યામીતિ
 પ્રથમત ઉક્ત્વા પરમેશ્વરેણેદં કથિતં, તેષાં ચિત્તે મમ વિધીન્ સ્થાપયિષ્યામિ
 તેષાં મનઃસુ ય તાન્ લેખિષ્યામિ ચ, 17 અપરઞ્ચ તેષાં પાપાન્યપરાધાંશ્ચ
 પુનઃ કદાપિ ન સ્મારિષ્યામિ | " 18 કિન્તુ યત્ર પાપમોચનં ભવતિ તત્ર
 પાપાર્થકબલિદાનં પુનર્ન ભવતિ | 19 અતો હે ભ્રાતરઃ, યીશો રુધિરેણ
 પવિત્રસ્થાનપ્રવેશાયાસ્માકમ્ ઉત્સાહો ભવતિ, 20 યતઃ સોડસ્મદર્થં
 તિરસ્કરિણ્યાર્થતઃ સ્વશરીરેણ નવીનં જીવનયુક્તઞ્ચૈકં પન્થાનં નિર્મિતવાન્,
 21 અપરઞ્ચેશ્વરીયપરિવારસ્યાધ્યક્ષ એકો મહાયાજકોડસ્માકમસ્તિ |
 22 અતો હેતોરસ્માભિઃ સરલાન્તઃકરણૌ દૃઢવિશ્વાસૈઃ પાપબોધાત્
 પ્રક્ષાલિતમનોભિ નિર્મલજલે સ્નાતશરીરૈશ્ચેશ્વરમ્ ઉપાગત્ય પ્રત્યાશાયાઃ
 પ્રતિજ્ઞા નિશ્ચલા ધારયિતવ્યા | 23 યતો યસ્તામ્ અફીકૃતવાન્ સ
 વિશ્વસનીયઃ | 24 અપરં પ્રેમ્નિ સત્ક્રિયાસુ ચૈકૈકસ્યોત્સાહવૃદ્ધ્યર્થમ્
 અસ્માભિઃ પરસ્પરં મન્ત્રયિતવ્યં | 25 અપરં કતિપયલોકા યથા કુર્વન્તિ
 તથાસ્માભિઃ સભાકરણં ન પરિત્યક્તવ્યં પરસ્પરમ્ ઉપદેષ્ટવ્યઞ્ચ યતસ્તત્
 મહાદિનમ્ ઉત્તરોત્તરં નિકટવર્તિ ભવતીતિ યુષ્માભિ દૃશ્યતે | 26 સત્યમતસ્ય
 જ્ઞાનપ્રાપ્તેઃ પરં યદિ વયં સ્વંચ્છયા પાપાચારં કુર્મ્મસ્તર્હિ પાપાનાં કૃતે
 ડન્યત્ કિમપિ બલિદાનં નાવશિષ્યતે 27 કિન્તુ વિચારસ્ય ભયાનકા પ્રતીક્ષા
 રિપુનાશકાનલસ્ય તાપશ્ચાવશિષ્યતે | 28 યઃ કશ્ચિત્ મૂસસો વ્યવસ્થામ્
 અવમન્યતે સ દયાં વિના દ્વયોસ્તિસૃણાં વા સાક્ષિણાં પ્રમાણેન ડન્યતે,
 29 તસ્માત્ કિં બુદ્ધ્યધ્વે યો જન ઇશ્વરસ્ય પુત્રમ્ અવજાનાતિ યેન ય
 પવિત્રીકૃતો ડભવત્ તત્ નિયમસ્ય રુધિરમ્ અપવિત્રં જાનાતિ, અનુગ્રહકરમ્
 આત્માનમ્ અપમન્યતે ય, સ કિયન્મહાધોરતરદણ્ડસ્ય યોગ્યો ભવિષ્યતિ?
 30 યતઃ પરમેશ્વરઃ કથયતિ, "દાનં ફલસ્ય મત્કર્મ સૂચિતં પ્રદદામ્યહં | "
 પુનરપિ, "તદા વિચારયિષ્યન્તે પરેશેન નિજાઃ પ્રજાઃ | " ઇદં યઃ કથિતવાન્
 તં વયં જાનીમઃ | 31 અમરેશ્વરસ્ય કરયોઃ પતનં મહાભયાનકં | 32 હે
 ભ્રાતરઃ, પૂર્વદિનાનિ સ્મરત યતસ્તદાનીં યૂયં દીપ્તિં પ્રાપ્ય બહુદુર્ગતિરૂપં

સંગ્રામં સહમાના એકતો નિન્દાકલેશૈઃ કૌતુકીકૃતા અભવત, 33 અન્યતશ્ચ તદ્ભોગિનાં સમાંશિનો ડભવત | 34 યૂયં મમ બન્ધનસ્ય દુઃખેન દુઃખિનો ડભવત, યુષ્માકમ્ ઉત્તમા નિત્યા ચ સમ્પત્તિઃ સ્વર્ગે વિદ્યત ઇતિ જ્ઞાત્વા સાનન્દં સર્વસ્વસ્યાપહરાણામ્ અસહધ્વઞ્ચ | 35 અતએવ મહાપુરસ્કારયુક્તં યુષ્માકમ્ ઉત્સાહં ન પરિત્યજત | 36 યતો યૂયં યેનેશ્વરસ્યેચ્છાં પાલયિત્વા પ્રતિજ્ઞાયાઃ ફલં લભધ્વં તદર્થં યુષ્માભિ ઘૈર્ય્યાવલમ્બનં કર્તવ્યં | 37 યેનાગન્તવ્યં સ સ્વલ્પકાલાત્ પરમ્ આગમિષ્યતિ ન ચ વિલમ્બિષ્યતે | 38 "પુણ્યવાન્ જનો વિશ્વાસેન જીવિષ્યતિ કિન્તુ યદિ નિવર્તતે તર્હિ મમ મનસ્તસ્મિન્ ન તોષં યાસ્યતિ | " 39 કિન્તુ વયં વિનાશજનિકાં ધર્માત્ નિવૃત્તિં ન કુર્વાણા આત્મનઃ પરિત્રાણાય વિશ્વાસં કુર્વામહે |

11 વિશ્વાસ આશંસિતાનાં નિશ્ચયઃ, અદૃશ્યાનાં વિષયાણાં દર્શનં ભવતિ | 2 તેન વિશ્વાસેન પ્રાપ્તો લોકાઃ પ્રામાણ્યં પ્રાપ્તવન્તઃ | 3 અપરમ્ ઇશ્વરસ્ય વાક્યેન જગન્ત્યસૃજ્યન્ત, દૃષ્ટવસ્તૂનિ ચ પ્રત્યક્ષવસ્તુભ્યો નોદપધન્તૈતદ્ વયં વિશ્વાસેન બુધ્યામહે | (aiṅ g165) 4 વિશ્વાસેન હાબિલ્ ઇશ્વરમુદ્દિશ્ય કાબિલઃ શ્રેષ્ઠં બલિદાનં કૃતવાન્ તસ્માચ્ચેશ્વરેણ તસ્ય દાનાન્યધિ પ્રમાણે દત્તે સ ધાર્મિક ઇત્યસ્ય પ્રમાણં લબ્ધવાન્ તેન વિશ્વાસેન ચ સ મૃતઃ સન્ અધાપિ ભાષતે | 5 વિશ્વાસેન હનોઙ્ યથા મૃત્યું ન પશ્યેત્ તથા લોકાન્તરં નીતઃ, તસ્યોદ્દેશશ્ચ કેનાપિ ન પ્રાપિ યત ઇશ્વરસ્તં લોકાન્તરં નીતવાન્, તત્પ્રમાણમિદં તસ્ય લોકાન્તરીકરણાત્ પૂર્વ્વં સ ઇશ્વરાય રોચિતવાન્ ઇતિ પ્રમાણં પ્રાપ્તવાન્ | 6 કિન્તુ વિશ્વાસં વિના કોડપીશ્વરાય રોચિતું ન શક્નોતિ યત ઇશ્વરોડસ્તિ સ્વાન્વેષિલોકેભ્યઃ પુરસ્કારં દદાતિ ચેતિકથાયામ્ ઇશ્વરશરણાગતૈ વિશ્વસિતવ્યં | 7 અપરં તદાનીં યાન્યદૃશ્યાન્યાસન્ તાનીશ્વરેણાદિષ્ટઃ સન્ નોહો વિશ્વાસેન ભીત્વા સ્વપરિજનાનાં રક્ષાર્થં પોતં નિર્મિતવાન્ તેન ચ જગજ્જનાનાં દોષાન્ દર્શિતવાન્ વિશ્વાસાત્ લભ્યસ્ય પુણ્યસ્યાધિકારી બભૂવ ચ | 8 વિશ્વાસેનેબ્રાહ્મીમ્ આહૂતઃ સન્ આજ્ઞાં ગૃહીત્વા યસ્ય સ્થાનસ્યાધિકારસ્તેન પ્રાપ્તવ્યસ્તત્ સ્થાનં પ્રસ્થિતવાન્ કિન્તુ પ્રસ્થાનસમયે ક્ક યામીતિ નાજનાત્ | 9 વિશ્વાસેન સ પ્રતિજ્ઞાતે દેશે પરદેશવત્ પ્રવસન્ તસ્યાઃ પ્રતિજ્ઞાયાઃ સમાનાંશિભ્યામ્ ઇસ્હકા યાકૂબા ચ સહ દૂષ્યવાસ્યભવત્ | 10 યસ્માત્ સ ઇશ્વરેણ નિર્મિતં

સ્થાપિતઞ્ચ ભિન્નિમૂલયુક્તં નગરં પ્રત્યૈક્ષત | 11 અપરઞ્ચ વિશ્વાસેન સારા
 વયોતિકાન્તા સન્ત્યપિ ગર્ભધારણાય શક્તિં પ્રાપ્ય પુત્રવત્યભવત્, યતઃ
 સા પ્રતિજ્ઞાકારિણં વિશ્વાસ્યમ્ અમન્યત | 12 તતો હેતો ભૂતકલ્યાદ્
 એકસ્માત્ જનાદ્ આકાશીયનક્ષત્રાણીવ ગણનાતીતાઃ સમુદ્રતીરસ્થસિકતા
 ઇવ યાસંખ્યા લોકા ઉત્પેદિરે | 13 એતે સર્વે પ્રતિજ્ઞાયાઃ ફલાન્યપ્રાપ્ય કેવલં
 દૂરાત્ તાનિ નિરીક્ષ્ય વન્દિત્વા ચ, પૃથિવ્યાં વયં વિદેશિનઃ પ્રવાસિનશ્ચાસ્મહ
 ઇતિ સ્વીકૃત્ય વિશ્વાસેન પ્રાણાન્ તત્યજુઃ | 14 યે તુ જના ઇત્યં કથયન્તિ
 તૈઃ પૈતૃકદેશો ડસ્માભિરન્વિષ્યત ઇતિ પ્રકાશ્યતે | 15 તે યસ્માદ્ દેશાત્
 નિર્ગતાસ્તં યદસ્મરિષ્યન્ તર્હિ પરાવર્તનાય સમયમ્ અલપ્સ્યન્ત | 16 કિન્તુ
 તે સર્વોત્કૃષ્ટમ્ અર્થતઃ સ્વર્ગીયં દેશમ્ આકાઙ્ક્ષન્તિ તસ્માદ્ ઇશ્વરસ્તાનધિ
 ન લજ્જમાનસ્તેષામ્ ઇશ્વર ઇતિ નામ ગૃહીતવાન્ યતઃ સ તેષાં કૃતે
 નગરમેકં સંસ્થાપિતવાન્ | 17 અપરમ્ ઇબ્રાહીમઃ પરીક્ષાયાં જાતાયાં સ
 વિશ્વાસેનેસ્હાકમ્ ઉત્સસર્જ, 18 વસ્તુત ઇસ્હાકિ તવ વંશો વિખ્યાસ્યત ઇતિ
 વાગ્ યમધિ કથિતા તમ્ અદ્વિતીયં પુત્રં પ્રતિજ્ઞાપ્રાપ્તઃ સ ઉત્સસર્જ | 19 યત
 ઇશ્વરો મૃતાનપ્યુત્યાપયિતું શકનોતીતિ સ મેને તસ્માત્ સ ઉપમાઙ્ગપં તં લેભે |
 20 અપરમ્ ઇસ્હાક વિશ્વાસેન યાકૂબ્ એષાવે ચ ભાવિવિષયાનધ્યાશિષં
 દદૌ | 21 અપરં યાકૂબ્ મરણકાલે વિશ્વાસેન યૂષકઃ પુત્રયોરેકૈકસ્મૈ
 જનાયાશિષં દદૌ યષ્ટ્યા અગ્રભાગે સમાલમ્બ્ય પ્રાણનામ ચ | 22 અપરં
 યૂષક યરમકાલે વિશ્વાસેનેસ્રાયેલ્વંશીયાનાં મિસરદેશાદ્ બહિર્ગમનસ્ય વાયં
 જગાદ નિજાસ્થીનિ યાધિ સમાદિદેશ | 23 નવજાતો મૂસાશ્ચ વિશ્વાસાત્
 ત્રાન્ માસાન્ સ્વપિતૃભ્યામ્ અગોપ્યત યતસ્તૌ સ્વશિશું પરમસુન્દરં દૃષ્ટવન્તૌ
 રાજાજ્ઞાઞ્ચ ન શક્વિતવન્તૌ | 24 અપરં વયઃપ્રાપ્તો મૂસા વિશ્વાસાત્ ફિરૌણો
 દૌહિત્ર ઇતિ નામ નાઙ્ગીયકાર | 25 યતઃ સ ક્ષણિકાત્ પાપજસુખભોગાદ્
 ઇશ્વરસ્ય પ્રજાભિઃ સાર્દ્ધ દુઃખભોગં વગ્રે | 26 તથા મિસરદેશીયનિધિભ્યઃ
 ખ્રીષ્ટનિમિત્તાં નિન્દાં મહર્તી સમ્પત્તિં મેને યતો હેતોઃ સ પુરસ્કારદાનમ્
 અપૈક્ષત | 27 અપરં સ વિશ્વાસેન રાજાઃ ક્રોધાત્ ન ભીત્વા મિસરદેશં
 પરિતત્યાજ, યતસ્તેનાદૃશ્યં વીક્ષમાણેનેવ ધૈર્યમ્ આલમ્બિ | 28 અપરં
 પ્રથમજાતાનાં હન્તા યત્ સ્વીયલોકાન્ ન સ્પૃશેત્ તદર્થં સ વિશ્વાસેન
 નિસ્તારપર્વ્યાયબલિચ્છેદનં રુધિરસેયનઞ્ચાનુષ્ઠિતાવાન્ | 29 અપરં તે

विश्वासात् स्थलेनेव सूक्ष्मागरेण जग्मुः किन्तु भिस्त्रीयलोकास्तत् कर्तुम्
 उपकृत्य तोयेषु ममज्जुः | 30 अपरत्र विश्वासात् तैः सप्ताहं यावद्
 यिरीहोः प्रायीरस्य प्रदक्षिणो कृते तत् निपपात | 31 विश्वासाद् राह्वनामिका
 वेश्यापि प्रीत्या यारान् अनुगृह्याविश्वासिभिः सार्द्धं न विननाश | 32 अधिकं
 किं कथयिष्यामि? गिदियोनो बारकः शिम्शोनो यिप्तहो दायूद् शिम्भूयेलो
 भविष्यद्वादिनश्चैतेषां वृत्तान्तकथनाय मम समयाभावो भविष्यति | 33
 विश्वासात् ते राज्यानि वशीकृतवन्तो धर्मकर्माणि साधितवन्तः प्रतिज्ञानां
 इलं लब्धवन्तः सिंढानां मुभानि रुद्धवन्तो 34 वहेर्दाहं निर्व्यापितवन्तः
 भङ्गधाराद् रक्षां प्राप्तवन्तो दौर्बल्ये सबलीकृता युद्धे पराक्रमिणो जाताः
 परेषां सैन्यानि दवयितवन्तश्च | 35 योषितः पुनरुत्थानेन मृतान् आत्मजान्
 लेभिरे, अपरे य श्रेष्ठोत्थानस्य प्राप्तेराशया रक्षाम् अगृहीत्वा ताऽनेन
 मृतवन्तः | 36 अपरे तिरस्कारैः कशाभिर्बन्धनैः कारया य परीक्षिताः | 37
 बहवश्च प्रस्तराघातैर्हताः करपत्रैर्वा विदीर्णा यन्त्रैर्वा क्लिष्टाः भङ्गधारैर्वा
 व्यापादिताः | ते भेषाणां छागानां वा यर्म्माणि परिधाय दीनाः पीडिता
 दुःभार्ताश्रमाभ्यन् | 38 संसारो येषाम् अयोग्यस्ते निर्जनस्थानेषु पर्वतेषु
 गह्वरेषु पृथिव्याश्छिद्रेषु य पर्यटन् | 39 अतैः सर्व्वे विश्वासात् प्रमाणां
 प्रापि किन्तु प्रतिज्ञायाः इलं न प्रापि | 40 यतस्ते यथास्मान् विना सिद्धा न
 भवेयुस्तथैवेश्वरेणास्माकं कृते श्रेष्ठतरं किमपि निर्दिदिशे |

12 अतो हेतोरेतावत्साक्षिमेधैर्वेष्टिताः सन्तो वयमपि सर्व्वभारम्
 आशुबाधकं पापत्र निक्षिप्यास्माकं गमनाय निरूपिते मार्गे धैर्य्येण धावाम |
 2 यश्चास्माकं विश्वासस्याग्रेसरः सिद्धिकर्ता यास्ति तं यीशुं वीक्षामहे
 यतः स स्वसम्भुजस्थितानन्दस्य प्राप्त्यर्थम् अपमानं तुच्छीकृत्य कुशस्य
 यातनां सोढवान् एश्वरीयसिंहासनस्य दक्षिणपार्श्वे समुपविष्टवांश्च | 3
 यः पापिभिः स्वरुद्धम् अतादृशं वैपरीत्यं सोढवान् तम् आलोचयत
 तेन यूयं स्वमनःसु श्रान्ताः क्लान्ताश्च न भविष्यथ | 4 यूयं पापेन सह
 युध्यन्तोऽद्यापि शोणितव्ययपर्य्यन्तं प्रतिरोधं नाकुरुत | 5 तथा य पुत्रान्
 प्रतीव युष्मान् प्रति य उपदेश उक्तस्तं किं विस्मृतवन्तः? "परेशेन कृतां
 शास्तिं हे मत्पुत्र न तुच्छय | तेन संभर्त्सितश्चापि नैव क्लाम्य कदायन | 6
 परेशः प्रीयते यस्मिन् तस्मै शास्तिं ददाति यत् | यन्तु पुत्रं स गृह्णाति तमेव

પ્રહરત્યપિ | " 7 યદિ યૂયં શાસ્તિં સહધ્વં તર્હીશ્વરઃ પુત્રૈરિવ યુષ્માભિઃ
 સાદ્ધ્વં વ્યવહરતિ યતઃ પિતા યસ્મૈ શાસ્તિં ન દદાતિ તાદૃશઃ પુત્રઃ કઃ? 8 સર્વો
 યસ્યાઃ શાસ્તેરેશિનો ભવન્તિ સા યદિ યુષ્માકં ન ભવતિ તર્હિ યૂયમ્ આત્મજા
 ન કિન્તુ જારજા આધ્યે | 9 અપરમ્ અસ્માકં શારીરિકજન્મદાતારોડસ્માકં
 શાસ્તિકારિણોડભવન્ તે યાસ્માભિઃ સમ્માનિતાસ્તસ્માદ્ ય આત્મનાં
 જનયિતા વયં કિં તતોડધિકં તસ્ય વશીભૂય ન જીવિષ્યામઃ? 10 તે
 ત્વલ્પદિનાનિ યાવત્ સ્વમનોડમતાનુસારેણ શાસ્તિં કૃતવન્તઃ કિન્ત્વેષોડસ્માકં
 હિતાય તસ્ય પવિત્રતાયા અંશિત્વાય યાસ્માન્ શાસ્તિ | 11 શાસ્તિશ્ચ
 વર્તમાનસમયે કેનાપિ નાનન્દજનિકા કિન્તુ શોકજનિકૈવ મન્યતે તથાપિ યે
 તથા વિનીયન્તે તેભ્યઃ સા પશ્ચાત્ શાન્તિયુક્તં ધર્મફલં દદાતિ | 12 અતએવ
 યૂયં શિથિલાન્ હસ્તાન્ દુર્બ્બલાનિ જાનૂનિ ચ સબલાનિ કુરુધ્વં | 13 યથા
 ચ દુર્બ્બલસ્ય સન્ધિસ્થાનં ન ભજ્યેત સ્વસ્થં તિષ્ઠેત્ તથા સ્વચરણાર્થ
 સરલં માર્ગં નિર્માત | 14 અપરઞ્ચ સર્વોઃ સાર્થમ્ એક્યભાવં યચ્ય વિના
 પરમેશ્વરસ્ય દર્શનં કેનાપિ ન લપ્સ્યતે તત્ પવિત્રત્વં ચેષ્ટધ્વં | 15 યથા કશ્ચિદ્
 ઇશ્વરસ્યાનુગ્રહાત્ ન પતેત્, યથા ચ તિક્તતાયા મૂલં પ્રરુહ્ય બાધાજનકં ન
 ભવેત્ તેન ચ બહવોડપવિત્રા ન ભવેયુઃ, 16 યથા ચ કશ્ચિત્ લમ્પટો વા
 એકકૃત્વ આહારાર્થં સ્વીયજ્યેષ્ઠાધિકારવિક્રેતા ય એષૌસ્તદ્દ્વદ્ અધર્માચારી ન
 ભવેત્ તથા સાવધાના ભવત | 17 યતઃ સ એષૌઃ પશ્ચાદ્ આશીર્વાદાધિકારી
 ભવિતુમ્ ઇચ્છન્નપિ નાનુગૃહીત ઇતિ યૂયં જાનીથ, સ યાશ્રુપાતેન મત્યન્તરં
 પ્રાર્થયમાનોડપિ તદ્દુપાયં ન લેભે | 18 અપરઞ્ચ સ્પૃશ્યઃ પર્વતઃ પ્રજ્વલિતો
 વહ્નિઃ કૃષ્ણાવાણો મેઘો ડન્ધકારો ઝન્બશ તૂરીવાધં વાક્યાનાં શબ્દશ્ચ નૈતેષાં
 સન્નિઘૌ યૂયમ્ આગતાઃ | 19 તં શબ્દં શ્રુત્વા શ્રોતાસ્તાદૃશં સમ્ભાષણં યત્
 પુનર્ન જાયતે તત્ પ્રાર્થિતવન્તઃ | 20 યતઃ પશુરપિ યદિ ધરાધરં સ્પૃશતિ
 તર્હિ સ પાષાણાઘાતૈર્હન્તવ્ય ઇત્યાદેશં સોઢું તે નાશકનુવન્ | 21 તચ્ય
 દર્શનમ્ એવં ભયાનકં યત્ મૂસસોક્તં ભીતસ્ત્રાસયુક્તશ્ચાસ્મીતિ | 22
 કિન્તુ સીયોન્ચર્વતો ડમરેશ્વરસ્ય નગરં સ્વર્ગસ્થયિરૂશાલમમ્ અચુતાનિ
 દિવ્યદૂતાઃ 23 સ્વર્ગો લિખિતાનાં પ્રથમજાતાનામ્ ઉત્સવઃ સમિતિશ્ચ સર્વોષાં
 વિચારાધિપતિરીશ્વરઃ સિદ્ધીકૃતધાર્મિકાનામ્ આત્માનો 24 નૂતનનિયમસ્ય
 મધ્યસ્થો યીશુઃ, અપરં હાબિલો રક્તાત્ શ્રેયઃ પ્રચારકં પ્રોક્ષણસ્ય રક્તઞ્ચૈતેષાં

सन्निधौ यूयम् आगताः । 25 सावधाना भवत तं वक्तारं नावजानीत
यतो हेतोः पृथिवीस्थितः स वक्ता यैरवज्ञातस्तै र्यदि रक्षा नाप्रापि तर्हि
स्वर्गीयवक्तुः पराङ्गुभीभूयास्माभिः कथं रक्षा प्राप्स्यते? 26 तदा तस्य
रवात् पृथिवी कम्पिता किन्विदानीं तेनेदं प्रतिज्ञातं यथा, "अहं पुनरेककृत्यः
पृथिवीं कम्पयिष्यामि केवलं तन्नहि गगनमपि कम्पयिष्यामि । " 27 स
अेककृत्यः शब्दो निश्चलविषयाणां स्थितये निर्मितानामिव यञ्जलवस्तूनां
स्थानान्तरीकराणां प्रकाशयति । 28 अतयेव निश्चलराज्यप्राप्तैरस्माभिः
सोऽनुग्रह आलम्बितव्यो येन वयं सादरं सभयञ्च तुष्टिजनकरूपेणेश्वरं
सेवितुं शक्नुयाम । 29 यतोऽस्माकम् ईश्वरः संहारको वह्निः ।

13 ब्रातृषु प्रेम तिष्ठतु । अतिथिसेवा युष्माभिर्न विस्मर्यतां 2
यतस्तथा प्रच्छन्नरूपेण दिव्यदूताः केषाञ्चिद् अतिथयोऽभवन् । 3 बन्दिनः
सहबन्दिभिरिव दुःखिनश्च देहवासिभिरिव युष्माभिः स्मर्यन्तां । 4 विवादः
सर्वेषां समीपे सम्मानितव्यस्तदीयशय्या य शुचिः किन्तु वेश्यागामिनः
पारदारिकाश्वेश्वरेण दण्डयिष्यन्ते । 5 यूयम् आचारं निर्लोभा भवत
विद्यमानविषये सन्तुष्यत य यस्माद् ईश्वर अवेदं कथितवान्, यथा, "त्वां
न त्यक्ष्यामि न त्वां ह्यस्यामि । " 6 अतयेव वयम् उत्साहेनेदं कथयितुं
शक्नुमः, "मत्पक्षे परमेशोऽस्ति न भेष्यामि कदायन । यस्मात् मां प्रति किं
कर्तुं मानवः पारयिष्यति । " 7 युष्माकं ये नायका युष्मभ्यम् ईश्वरस्य
वाक्यं कथितवन्तस्ते युष्माभिः स्मर्यन्तां तेषाम् आचारस्य परिणामम्
आलोच्य युष्माभिस्तेषां विश्वासोऽनुक्रियतां । 8 यीशुः प्रीष्टः श्वोऽध
सदा य स अेवास्ते । (aīōn g165) 9 यूयं नानाविधनूतनशिक्षाभिर्न
परिवर्तध्वं यतोऽनुग्रहेणान्तःकराणस्य सुस्थिरीभवनं क्षेमं न य भाधद्रव्यैः ।
यतस्तदाचारिणस्तैर्नोपकृताः । 10 ये दृश्यस्य सेवां कुर्वन्ति ते यस्या
द्रव्यभोजनस्थानधिकारिणस्तादृशी यज्ञवेदिरस्माकम् आस्ते । 11 यतो
येषां पशूनां शोणितं पापनाशाय मलायाजकेन मलापवित्रस्थानस्याभ्यन्तरं
नीयते तेषां शरीराणि शिबिराद् बहिर्दहन्ते । 12 तस्माद् यीशुरपि यत्
स्वरुधिरेण प्रजाः पवित्रीकुर्यात् तदर्थं नगरद्वारस्य बहिर्भूतिं लुक्तवान् ।
13 अतो हेतोरस्माभिरपि तस्यापमानं सहमानैः शिबिराद् बहिस्तस्य
समीपं गन्तव्यं । 14 यतो ऽत्रास्माकं स्थायि नगरं न विधते किन्तु भावि

નગરમ્ અસ્માભિરન્વિષ્યતે | 15 અતએવ યીશુનાસ્માભિ નિત્યં પ્રશંસારૂપો
 બલિરર્થતસ્તસ્ય નામાઙ્ગીકુર્વતામ્ ઓષ્ઠાધરાણાં ફલમ્ ઇશ્વરાય દાતવ્યં |
 16 અપરઞ્ચ પરોપકારો દાનઞ્ચ યુષ્માભિ ન વિસ્મર્યતાં યતસ્તાદૃશં બલિદાનમ્
 ઇશ્વરાય રોચતે | 17 યૂયં સ્વનાયકાનામ્ આજ્ઞાગ્રાહિણો વશ્યાશ્ચ ભવત
 યતો યૈરુપનિધિઃ પ્રતિદાતવ્યસ્તાદૃશા લોકા ઇવ તે યુષ્મદીયાત્મનાં રક્ષણાર્થં
 જાગ્રતિ, અતસ્તે યથા સાનન્દાસ્તત્ કુર્યુ ન ચ સાર્ત્તસ્વરા અત્ર યતધ્વં
 યતસ્તેષામ્ આર્ત્તસ્વરો યુષ્માકમ્ ઇષ્ટજનકો ન ભવેત્ | 18 અપરઞ્ચ યૂયમ્
 અસ્મન્નિમિત્તિં પ્રાર્થનાં કુરુત યતો વયમ્ ઉત્તમમનોવિશિષ્ટાઃ સર્વત્ર સદાયારં
 કર્તુમ્ ઇચ્છુકાશ્ચ ભવામ ઇતિ નિશ્ચિતં જાનીમઃ | 19 વિશેષતોડહં યથા
 ત્વરયા યુષ્મભ્યં પુન ઈયે તદર્થં પ્રાર્થનાયૈ યુષ્માન્ અધિકં વિનયે | 20
 અનન્તનિયમસ્ય રુધિરેણ વિશિષ્ટો મહાન્ મેષપાલકો યેન મૃતગણમધ્યાત્
 પુનરાનાયિ સ શાન્તિદાયક ઇશ્વરો (aiōnios g166) 21 નિજાભિમતસાધનાય
 સર્વસ્મિન્ સત્કર્મ્મણિ યુષ્માન્ સિદ્ધાન્ કરોતુ, તસ્ય દૃષ્ટૌ ય યદત્ તુષ્ટિજનકં
 તદેવ યુષ્માકં મધ્યે યીશુના ખ્રીષ્ટેન સાધયતુ | તસ્મૈ મહિમા સર્વદા ભૂયાત્ |
 આમેન્ | (aiōn g165) 22 હે ભ્રાતરઃ, વિનયેડહં યૂયમ્ ઇદમ્ ઉપદેશવાક્યં
 સહધ્વં યતોડહં સંક્ષેપેણ યુષ્માન્ પ્રતિ લિખિતવાન્ | 23 અસ્માકં ભ્રાતા
 તીમથિયો મુક્તોડભવદ્ ઇતિ જાનીત, સ ય યદિ ત્વરયા સમાગચ્છતિ તર્હિ
 તેન સાર્દ્ધમ્ અહં યુષ્માન્ સાક્ષાત્ કરિષ્યામિ | 24 યુષ્માકં સર્વાન્ નાયકાન્
 પવિત્રલોકાંશ્ચ નમસ્કુરુત | અપરમ્ ઇતાલિયાદેશીયાનાં નમસ્કારં જ્ઞાસ્યથ |
 25 અનુગ્રહો યુષ્માકં સર્વેષાં સહાયો ભૂયાત્ | આમેન્ |

याकूबः

1 एश्वरस्य प्रभो र्यीशुप्रीष्टस्य य दासो याकूब् विकीर्णीभूतान् द्वादशं वंशान् प्रति नमस्कृत्य पत्रं लिखति। 2 हे मम भ्रातरः, यूयं यदा बहुविधपरीक्षाषु निपतत तदा तत् पूर्णानन्दस्य कारणां मन्यध्वं। 3 यतो युष्माकं विश्वासस्य परीक्षितत्वेन धैर्यं सम्पाद्यत इति जानीथ। 4 तस्य धैर्यं सिद्धकृतं भवतु तेन यूयं सिद्धाः सम्पूर्णाश्च भविष्यथ कस्यापि गुणस्याभावश्च युष्माकं न भविष्यति। 5 युष्माकं कस्यापि ज्ञानाभावो यदि भवेत् तर्हि य एश्वरः सरलभावेन तिरस्कारञ्च विना सर्वेभ्यो ददाति ततः स यायतां ततस्तस्मै दायिष्यते। 6 किन्तु स निःसन्देहः सन् विश्वासेन यायतां यतः सन्दिग्धो मानवो वायुना यालितस्योत्पलवमानस्य य समुद्रतरङ्गस्य सदृशो भवति। 7 तादृशो मानवः प्रभोः किञ्चित् प्राप्स्यतीति न मन्यतां। 8 द्विमना लोकः सर्वगतिषु यत्रलो भवति। 9 यो भ्राता नम्रः स निजोन्नत्या श्लाघतां। 10 यश्च धनवान् स निजनम्रतया श्लाघतांयतः स तृणपुष्पवत् क्षयं गमिष्यति। 11 यतः सतापेन सूर्योऽपि दित्य तृणं शोष्यते तत्पुष्पञ्च ब्रूयति तेन तस्य रूपस्य सौन्दर्यं नश्यति तद्बद्ध धनिलोकोऽपि स्वीयमूढतया भ्वास्यति। 12 यो जनः परीक्षां सलते स अेव धन्यः, यतः परीक्षितत्वं प्राप्य स प्रभुना स्वप्रेमकारिभ्यः प्रतिज्ञातं शुवनमुकुटं लप्स्यते। 13 एश्वरो मां परीक्षत इति परीक्षासमये कोऽपि न वदतु यतः पापायेश्वरस्य परीक्षा न भवति स य कमपि न परीक्षते। 14 किन्तु यः कश्चित् स्वीयमनोवाञ्छयाकृष्यते लोभ्यते य तस्यैव परीक्षा भवति। 15 तस्मात् सा मनोवाञ्छा सगर्भा भूत्वा दुष्कृतिं प्रसूते दुष्कृतिश्च परिणामं गत्वा मृत्युं जनयति। 16 हे मम प्रियभ्रातरः, यूयं न भ्राभ्यत। 17 यत् किञ्चिद् उत्तमं दानं पूर्णो वरश्च तत् सर्वम् उर्द्ध्वाद् अर्थतो यस्मिन् दशान्तरं परिवर्तनजातच्छाया वा नास्ति तस्माद् दीप्त्याकरात् पितुरवरोडति। 18 तस्य सृष्टवस्तूनां मध्ये वयं यत् प्रथमङ्गलस्वरूपा भवामस्तदर्थं स स्वेच्छातः सत्यमतस्य वाक्येनास्मान् जनयामास। 19 अतः अेव हे मम प्रियभ्रातरः, युष्माकम् अकैको जनः श्रवाणे त्वरितः कथने धीरः क्रोधेऽपि धीरो भवतु। 20 यतो मानवस्य क्रोध एश्वरीयधर्मं न साधयति। 21 अतो हेतो यूयं सर्वाम् अशुचिक्रियां दृष्टताबाहुल्यञ्च

निक्षिप्य युष्मन्मनसां परित्राणो समर्थं रोपितं वाक्यं नम्रभावेन गृह्णीत |
 22 अपरत्र यूयं केवलम् आत्मवञ्चयितारो वाक्यस्य श्रोतारो न भवत
 किन्तु वाक्यस्य कर्मकारिणो भवत | 23 यतो यः कश्चिद् वाक्यस्य
 कर्मकारी न भूत्वा केवलं तस्य श्रोता भवति स दर्पणो स्वीयशारीरिकवदनं
 निरीक्षमाणस्य मनुजस्य सदृशः | 24 आत्माकारे दृष्टे स प्रस्थाय कीदृश
 आसीत् तत् तत्क्षणाद् विस्मरति | 25 किन्तु यः कश्चित् नत्वा मुक्तेः
 सिद्धां व्यवस्थाम् आलोक्य तिष्ठति स विस्मृतियुक्तः श्रोता न भूत्वा
 कर्मकर्त्तव्यं सन् स्वकार्यं धन्यो भविष्यति | 26 अनायत्तरसनः सन् यः
 कश्चित् स्वमनो वञ्चयित्वा स्वं भक्तं मन्यते तस्य भक्तिर्भूधा भवति | 27
 क्लेशकाले पितृहीनानां विधवानाञ्च यद् अवेक्षणं संसाराख्य निष्कलङ्केन
 यद् आत्मरक्षणं तदेव पितुरीश्वरस्य साक्षात् शुचिर्निर्मला य भक्तिः |

2 हे मम भ्रातरः, यूयम् अस्माकं तेजस्विनः प्रभो र्थीशुभ्रीष्टस्य धर्म
 मुष्मापेक्षया न धारयत | 2 यतो युष्माकं सभायां स्वर्णाङ्गुरीयकयुक्ते
 ब्राह्मिण्युपरिच्छेदे पुरुषे प्रविष्टे मलिनवस्त्रे कस्मिंश्चिद् दरिद्रेऽपि प्रविष्टे
 3 यूयं यदि तं ब्राह्मिण्युपरिच्छेदवसानं ज्ञानं निरीक्ष्य वदेत भवान्
 अत्रोत्तमस्थानं उपविशत्विति किञ्च तं दरिद्रं यदि वदेत त्वम् अमुस्मिन्
 स्थाने तिष्ठ यद्वात्र मम पादपीठं उपविशेति, 4 तर्हि मनःसु विशेष्य यूयं
 किं कुतर्कैः कुवियारका न भवथ? 5 हे मम प्रियभ्रातरः, शृणुत, संसारे
 ये दरिद्रास्तान् ईश्वरो विश्वासेन धनिनः स्वप्नेमकारिभ्यश्च प्रतिश्रुतस्य
 राज्यस्याधिकारिणः कर्तुं किं न वरीतवान्? किन्तु दरिद्रो युष्माभिरवज्ञायते |
 6 धनवन्त एव किं युष्मान् नोपद्रवन्ति बलाख्य विचारानानां समीपं न
 नयन्ति? 7 युष्मदुपरि परिकीर्तितं परमं नाम किं तैरेव न निन्दते? 8 किञ्च
 त्वं स्वसमीपवासिनि स्वात्मवत् प्रीयस्व, अतच्छास्त्रीयवयनानुसारतो
 यदि यूयं राजकीयव्यवस्थां पालयथ तर्हि भद्रं कुरुथ | 9 यदि य मुष्मापेक्षां
 कुरुथ तर्हि पापम् आग्रथ व्यवस्थया याज्ञालङ्घिन एव दूष्यध्वे | 10
 यतो यः कश्चित् कृत्स्नां व्यवस्थां पालयति स यद्येकस्मिन् विधौ स्मलति
 तर्हि सर्वेषाम् अपराधी भवति | 11 यतो हेतोस्त्वं परदारान् मा गच्छेति
 यः कथितवान् स एव नरहत्यां मा कुर्व्यां एत्यपि कथितवान् तस्मात् त्वं
 परदारान् न गत्वा यदि नरहत्यां करोषि तर्हि व्यवस्थालङ्घी भवसि |

12 મુક્તે વ્યવસ્થાતો યેષાં વિચારેણ ભવિતવ્યં તાદૃશા લોકા ઇવ યૂયં
કથાં કથયત કર્મ કુરુત ચ | 13 યો દયાં નાયરતિ તસ્ય વિચારો નિર્દયેન
કારિષ્યતે, કિન્તુ દયા વિચારમ્ અભિભવિષ્યતિ | 14 હે મમ ભ્રાતરઃ, મમ
પ્રત્યયોડસ્તીતિ યઃ કથયતિ તસ્ય કર્માણિ યદિ ન વિધન્ત તર્હિ તેન કિં
ફલં? તેન પ્રત્યયેન કિં તસ્ય પરિત્રાણં ભવિતું શકનોતિ? 15 કેષુચિદ્ ભ્રાતૃષુ
ભગિનીષુ વા વસનહીનેષુ પ્રાત્યહિકાહારહીનેષુ ચ સત્સુ યુષ્માકં કોડપિ
તેભ્યઃ શરીરાર્થં પ્રયોજનીયાનિ દ્રવ્યાણિ ન દત્વા યદિ તાન્ વદેત્, 16 યૂયં
સકુશલં ગત્વોષ્ણગાત્રા ભવત તૃપ્યત ચેતિ તર્હોતેન કિં ફલં? 17 તદ્વત્
પ્રત્યયો યદિ કર્મભિ ર્યુક્તો ન ભવેત્ તર્હોકાકિત્વાત્ મૃત એવાસ્તે | 18
કિન્તુ કશ્ચિદ્ ઇદં વદિષ્યતિ તવ પ્રત્યયો વિધતે મમ ચ કર્માણિ વિધન્તે,
ત્વં કર્મહીનં સ્વપ્રત્યયં માં દર્શય તર્હાહમપિ મત્કર્મભ્યઃ સ્વપ્રત્યયં ત્વાં
દર્શયિષ્યામિ | 19 એક ઇશ્વરો ડસ્તીતિ ત્વં પ્રત્યેષિ | ભદ્રં કરોષિ | ભૂતા
અપિ તત્ પ્રતિચન્તિ કમ્પન્તે ચ | 20 કિન્તુ હે નિબ્બોધમાનવ, કર્મહીનઃ
પ્રત્યયો મૃત એવાસ્ત્યેતદ્ અવગન્તું કિમ્ ઇચ્છસિ? 21 અસ્માકં પૂર્વપુરુષો
ય ઇબ્રાહીમ્ સ્વપુત્રમ્ ઇસ્હાકં યજ્ઞવેદ્યામ્ ઉત્સૃષ્ટવાન્ સ કિં કર્મભ્યો ન
સપુણ્યીકૃતાઃ? 22 પ્રત્યયે તસ્ય કર્માણાં સહકારિણિ જાતે કર્મભિઃ પ્રત્યયઃ
સિદ્ધો ડભવત્ તત્ કિં પશ્યસિ? 23 ઇત્યગ્રેદં શાસ્ત્રીયવચનં સફલમ્
અભવત્, ઇબ્રાહીમ્ પરમેશ્વરે વિશ્વસિતવાન્ તચ્ચ તસ્ય પુણ્યાયાગાયત
સ ચેશ્વરસ્ય મિત્ર ઇતિ નામ લબ્ધવાન્ | 24 પશ્યત માનવઃ કર્મભ્યઃ
સપુણ્યીક્રિયતે ન ચૈકાકિના પ્રત્યયેન | 25 તદ્વદ્ યા રાહબ્નામિકા વારાજ્ઞના
ચારાન્ અનુગૃહ્યાપરેણ માર્ગેણ વિસસર્જ સાપિ કિં કર્મભ્યો ન સપુણ્યીકૃતા?
26 અતએવાત્મહીનો દેહો યથા મૃતોડસ્તિ તથૈવ કર્મહીનઃ પ્રત્યયોડપિ
મૃતોડસ્તિ |

3 હે મમ ભ્રાતરઃ, શિક્ષકૈરસ્માભિ ગુરુતરદાડો લપ્સ્યત ઇતિ જ્ઞાત્વા યૂયમ્
અનેકે શિક્ષકા મા ભવત | 2 યતઃ સર્વે વયં બહુવિષયેષુ સ્ખલામઃ, યઃ
કશ્ચિદ્ વાક્યે ન સ્ખલતિ સ સિદ્ધપુરુષઃ કૃત્સ્નં વશીકર્તુ સમર્થશ્ચાસ્તિ |
3 પશ્યત વયમ્ અશ્વાન્ વશીકર્તુ તેષાં વક્ત્રેષુ ખલીનાન્ નિધાય તેષાં
કૃત્સ્નં શરીરમ્ અનુવર્તયામઃ | 4 પશ્યત યે પોતા અતીવ બૃહદાકારાઃ
પ્રચાડવાતૈશ્ચ ચાલિતાસ્તેડપિ કર્ણધારસ્ય મનોડભિમતાદ્ અતિક્ષુદ્રેણ

कर्णेन वाञ्छितं स्थानं प्रत्यनुवर्तन्ते। 5 तद्वद् रसनापि क्षुद्रतराङ्गं सन्ती
 र्धर्षवाक्यानि भाषते। पश्य कीदृक्खडारण्यं दहते ऽल्पेन वह्निना। 6 रसनापि
 भवेद् वह्निरधर्मत्रुपिष्टपे। अस्मदङ्गेषु रसना तादृशं सन्तिष्ठति सा कृत्स्नं
 देहं कलङ्कयति सृष्टिरथस्य यत्कं प्रज्वलयति नरकानलेन ज्वलयति य।
 (Geenna g1067) 7 पशुपक्ष्युरोगजलयराराणां सर्वेषां स्वभावो दमयितुं
 शक्यते मानुषिकस्वभावेन दमयाञ्चके य। 8 किन्तु मानवानां केनापि जिह्वा
 दमयितुं न शक्यते सा न निवार्य्याम् अनिष्टं उलाहलविषेण पूर्णा य। 9
 तथा वयं पितरम् ईश्वरं धन्यं वदामः, तथा येश्वरस्य सादृश्ये सृष्टान्
 मानवान् शपामः। 10 अेकस्माद् वदनाद् धन्यवाद्दशापौ निर्गच्छतः। हे
 मम भ्रातरः, अेतादृशं न कर्त्तव्यं। 11 प्रस्रवाणः किम् अेकस्मात् छिद्रात्
 मिष्टं तिक्तञ्च तोयं निर्गमयति? 12 हे मम भ्रातरः, उडुम्बरतरुः किं
 जितङ्गलानि द्राक्षालता वा किम् उडुम्बरङ्गलानि इलितुं शक्नोति? तद्वद् अेकः
 प्रस्रवाणो लवणमिष्टे तोये निर्गमयितुं न शक्नोति। 13 युष्माकं मध्ये ज्ञानी
 सुबोधश्च क आस्ते? तस्य कर्माणि ज्ञानमूलकमूढतायुक्तानीति सदायारात्
 स प्रमाणयतु। 14 किन्तु युष्मन्तःकरणमध्ये यदि तिक्तेर्ष्या विवादेच्छा य
 विधते तर्हि सत्यमतस्य विरुद्धं न श्लाघध्वं नयानृतं कथयत। 15 तादृशं
 ज्ञानम् उर्द्ध्वाद् आगतं नहि किन्तु पार्थिवं शरीरि भौतिकञ्च। 16 यतो
 हेतोरीर्ष्या विवादेच्छा य यत्र वेधेते तत्रैव कलहः सर्व्वं दुष्कृतञ्च विधते। 17
 किन्तुर्द्ध्वाद् आगतं यत् ज्ञानं तत् प्रथमं शुचि ततः परं शान्तं क्षान्तम्
 आशुसन्धेयं दयादिसत्त्वैः परिपूर्णम् असन्दिग्धं निष्कपटञ्च भवति। 18
 शान्त्यायारिभिः शान्त्या धर्मङ्गलं रोप्यते।

4 युष्माकं मध्ये समरा रणश्च कुत उत्पद्यन्ते? युष्मदङ्गशिबिराश्रिताभ्यः
 सुप्नेच्छाभ्यः किं नोत्पद्यन्ते? 2 यूयं वाञ्छथ किन्तु नाप्नुथ, यूयं नरहत्याम्
 र्थ्याञ्च कुरुथ किन्तु कृतार्था भवितुं न शक्नुथ, यूयं युध्यथ रणं कुरुथ
 य किन्वप्राप्तास्तिष्ठथ, यतो हेतोः प्रार्थनां न कुरुथ। 3 यूयं प्रार्थयध्वे
 किन्तु न लभध्वे यतो हेतोः स्वसुभ्रभोगेषु व्ययार्थं कु प्रार्थयध्वे। 4
 हे व्यभियारिणो व्यभियारिणश्च, संसारस्य यत् मैत्र्यं तद् ईश्वरस्य
 शात्रवमिति यूयं किं न जानीथ? अत अेव यः कश्चित् संसारस्य मित्रं
 भवितुम् अभिलषति स अेवेश्वरस्य शत्रु भवति। 5 यूयं किं मन्यध्वे?

शास्त्रस्य वाक्यं किं इललीनं भवेत्? अस्मदन्तर्वासी य आत्मा स वा
किम् एष्यार्थं प्रेम करोति? 6 तन्नहि किन्तु स प्रतुलं वरं वितरति तस्माद्
उक्तमास्ते यथा, आत्माभिमानलोकानां विपक्षो भवतीश्वरः | किन्तु तेनैव
नम्रेभ्यः प्रसादाद् दीयते वरः | | 7 अतश्चेव यूयम् एश्वरस्य वश्या भवत
शयतानं संरुन्ध तेन स युष्मत्तः पलायिष्यते | 8 एश्वरस्य समीपवर्तिनो
भवत तेन स युष्माकं समीपवर्ती भविष्यति | 9 पापिनः, यूयं स्वकरान्
परिष्कुरुध्वं | 10 द्विमनोलोकाः, यूयं स्वान्तःकरणानि शुचीनि कुरुध्वं | 9
यूयम् उद्विजध्वं शोयत विलपत य, युष्माकं हासः शोकाय, आनन्दश्च
कातरतायै परिवर्त्ततां | 10 प्रभोः समक्षं नम्रा भवत तस्मात् स युष्मान्
उच्यीकरिष्यति | 11 हे भ्रातरः, यूयं परस्परं मा दूषयत | यः कश्चिद् भ्रातरं
दूषयति भ्रातुर्वियारञ्ज करोति स व्यवस्थां दूषयति व्यवस्थायाश्च वियारं
करोति | त्वं यदि व्यवस्थाया वियारं करोषि तर्हि व्यवस्थापालयिता न
भवसि किन्तु वियारयिता भवसि | 12 अद्वितीयो व्यवस्थापको वियारयिता
य स अवास्ते यो रक्षितुं नाशयितुञ्च पारयति | किन्तु कस्त्वं यत् परस्य
वियारं करोषि? 13 अध श्वो वा वयम् अमुकनगरं गत्वा तत्र वर्षभेकं
यापयन्तो वाणिज्यं करिष्यामः लाभं प्राप्स्यामश्चेति कथां भाषमाणा
यूयम् एदानीं शृणुत | 14 श्वः किं घटिष्यते तद् यूयं न जानीथ यतो
ज्वनं वो भवेत् कीदृक् तत्तु बाष्पस्वरूपकं, क्षणमात्रं भवेद् दृश्यं लुप्यते य
ततः परं | 15 तदनुकृत्वा युष्माकम् एदं कथनीयं प्रभोरिच्छातो वयं यदि
ज्वामस्तर्ह्येतत् कर्म तत् कर्म वा करिष्याम एति | 16 किन्त्विदानीं यूयं
गर्व्वाक्यैः श्लाघनं कुरुध्वे तादृशं सर्व्वं श्लाघनं कुत्सितमेव | 17 अतो यः
कश्चित् सत्कर्म कर्त्त विदित्वा तन्न करोति तस्य पापं जायते |

5 हे धनवन्तः, यूयम् एदानीं शृणुत युष्माभिरागमिष्यत्कलेशहेतोः कन्धतां
विलप्यताञ्च | 2 युष्माकं द्रविणं ज्वर्णं कीटमुक्ताः सुखेलकाः | 3 कनकं
रजतञ्चापि विकृतिं प्रगमिष्यति, तत्कलङ्गश्च युष्माकं पापं प्रमाणयिष्यति,
दुताशवय्य युष्माकं पिशितं भादयिष्यति | 4 एतन्मिधस्रेषु युष्माभिः
सञ्चितं धनं | 4 पश्यत यैः कृषीवलै र्युष्माकं शस्यानि छिन्नानि तेभ्यो
युष्माभि र्यद् वेतनं छिन्नं तद् उच्यै ध्वनिं करोति तेषां शस्यच्छेदकानाम्
आर्त्तरावः सेनापतेः परमेश्वरस्य कर्णकुण्डरं प्रविष्टः | 5 यूयं पृथिव्यां

સુખભોગં કામુકતાઞ્ચારિતવન્તઃ, મહાભોજસ્ય દિન ઇવ નિજાન્તઃકરણાનિ
 પરિતર્પિતવન્તશ્ચ | 6 અપરઞ્ચ યુષ્માભિ ધાર્મિકસ્ય દણ્ડાજ્ઞા હત્યા ચાકારિ
 તથાપિ સ યુષ્માન્ ન પ્રતિરુદ્ધવાન્ | 7 હે ભ્રાતરઃ, યૂયં પ્રભોરાગમનં યાવદ્
 ધૈર્યમાલભધ્વં | પશ્યત કૃષિવલો ભૂમે ભંડુમૂલ્યં ફલં પ્રતીક્ષમાણો યાવત્
 પ્રથમમ્ અન્તિમઞ્ચ વૃષ્ટિજલં ન પ્રાપ્નોતિ તાવદ્ ધૈર્યમ્ આલભ્યતે | 8
 યૂયમપિ ધૈર્યમાલભ્ય સ્વાન્તઃકરણાનિ સ્થિરીકુરુત, યતઃ પ્રભોરુપસ્થિતિઃ
 સમીપવર્તિન્યભવત્ | 9 હે ભ્રાતરઃ, યૂયં યદ્ દણ્ડયા ન ભવેત તદર્થં પરસ્પરં
 ન ગ્લાયત, પશ્યત વિચારયિતા દ્વારસમીપે તિષ્ઠતિ | 10 હે મમ ભ્રાતરઃ, યે
 ભવિષ્યદ્વાદિનઃ પ્રભો નામ્ના ભાષિતવન્તસ્તાન્ યૂયં દુઃખસહનસ્ય ધૈર્યસ્ય
 ચ દૃષ્ટાન્તાન્ જાનીત | 11 પશ્યત ધૈર્યશીલા અસ્માભિ ધન્યા ઉચ્યન્તે |
 આયુષો ધૈર્યં યુષ્માભિરશ્રાવિ પ્રભોઃ પરિણામશ્રાદ્દર્શિ યતઃ પ્રભુ ભંડુકૃપઃ
 સકરુણશ્રાસ્તિ | 12 હે ભ્રાતરઃ વિશેષત ઇદં વદામિ સ્વર્ગસ્ય વા પૃથિવ્યા
 વાન્યવસ્તુનો નામ ગૃહીત્વા યુષ્માભિઃ કોડપિ શપથો ન ક્રિયતાં, કિન્તુ યથા
 દણ્ડયા ન ભવત તદર્થં યુષ્માકં તથૈવ તન્નહિ ચેતિવાક્યં યથેષ્ટં ભવતુ |
 13 યુષ્માકં કશ્ચિદ્ દુઃખી ભવતિ? સ પ્રાર્થનાં કરોતુ | કશ્ચિદ્ વાનન્દિતો
 ભવતિ? સ ગીતં ગાયતુ | 14 યુષ્માકં કશ્ચિત્ પીડિતો ડસ્તિ? સ સમિતેઃ
 પ્રાચીનાન્ આહ્વાતુ તે ચ પભો નામ્ના તં તૈલેનાભિષિચ્ય તસ્ય કૃતે પ્રાર્થનાં
 કુર્વન્તુ | 15 તસ્માદ્ વિશ્વાસજાતપ્રાર્થનયા સ રોગી રક્ષાં ચાસ્યતિ પ્રભુશ્ચ
 તમ્ ઉત્થાપયિષ્યતિ યદિ ચ કૃતપાપો ભવેત્ તર્હિ સ તં ક્ષમિષ્યતે | 16 યૂયં
 પરસ્પરમ્ અપરાધાન્ અફીકુરુધ્વમ્ આરોગ્યપ્રાપ્ત્યર્થઞ્ચૈકજનો ડન્યસ્ય
 કૃતે પ્રાર્થનાં કરોતુ ધાર્મિકસ્ય સયત્ના પ્રાર્થના બહુશક્તિવિશિષ્ટા ભવતિ |
 17 ચ એલિયો વચમિવ સુખદુઃખભોગી મર્ત્ય આસીત્ સ પ્રાર્થનયાનાવૃષ્ટિં
 યાચિતવાન્ તેન દેશે સાદ્ધૃવત્સરત્રયં યાવદ્ વૃષ્ટિ ન્ બભૂવ | 18 પશ્ચાત્
 તેન પુનઃ પ્રાર્થનાયાં કૃતાયામ્ આકાશસ્તોયાન્યવર્ષોત્ પૃથિવી ચ સ્વફલાનિ
 પ્રારોહ્યત્ | 19 હે ભ્રાતરઃ, યુષ્માકં કસ્મિંશ્ચિત્ સત્યમતાદ્ ભ્રષ્ટે યદિ કશ્ચિત્
 તં પરાવર્તયતિ 20 તર્હિ ચો જનઃ પાપિનં વિપથભ્રમણાત્ પરાવર્તયતિ સ
 તસ્યાત્માનં મૃત્યુત ઉદ્ધરિષ્યતિ બહુપાપાન્યાવરિષ્યતિ ચેતિ જાનાતુ |

१ पितरः

1 पन्त-गालातिया-कप्पडकिया-आशिया-बिथुनियामेशेषु प्रवासिनो ये
विडीर्णलोकाः 2 पितुरीश्वरस्य पूर्वनिर्णयाद् आत्मनः पावनेन
यीशुप्रीष्टस्याज्ञाग्रहाय शोणितप्रोक्षाय यामिरुयितास्तान् प्रति
यीशुप्रीष्टस्य प्रेरितः पितरः पत्रं लिखति | युष्मान् प्रति बाहुल्येन
शान्तिरनुग्रहश्च भूयास्तां | 3 अस्माकं प्रभो यीशुप्रीष्टस्य तात ईश्वरो
धन्यः, यतः स स्वकीयबहुकृपातो मृतगणमध्याद् यीशुप्रीष्टस्योत्थानेन
ज्वनप्रत्याशार्थम् अर्थतो 4 ऽक्षयनिष्कलङ्गाभ्लानसम्पत्तिप्राप्त्यर्थम्
अस्मान् पुनर्जन्तयामास | सा सम्पत्तिः स्वर्गे ऽस्माकं कृते सञ्चिता तिष्ठति,
5 यूयञ्चेश्वरस्य शक्तिः शेषकाले प्रकाश्यपरित्राणार्थं विश्वासेन रक्षध्वे |
6 तस्माद् यूयं यद्यप्यानन्देन प्रकुल्ला भवथ तथापि साम्प्रतं प्रयोजनहेतोः
क्रियत्कालपर्यन्तं नानाविधपरीक्षाभिः क्लिश्यध्वे | 7 यतो वह्निना यस्य
परीक्षा भवति तस्मात् नश्वरसुवर्णादपि बहुमूल्यं युष्माकं विश्वासज्ञपं
यत् परीक्षितं स्वर्णं तेन यीशुप्रीष्टस्यागमनसमये प्रशंसायाः समाहरस्य
गौरवस्य च योग्यता प्राप्तव्या | 8 यूयं तं प्रीष्टम् अदृष्ट्वापि तस्मिन्
प्रीयध्वे साम्प्रतं तं न पश्यन्तोऽपि तस्मिन् विश्वसन्तो ऽनिर्व्वयनीयेन
प्रभावयुक्तेन यानन्देन प्रकुल्ला भवथ, 9 स्वविश्वासस्य परिणामज्ञपम्
आत्मनां परित्राणं लभध्वे च | 10 युष्मासु यो ऽनुग्रहो वर्तते तद्विषये च
ईश्वरीयवाक्यं कथितवन्तस्ते भविष्यद्वादिनस्तस्य परित्राणस्यान्वेषणम्
अनुसन्धानञ्च कृतवन्तः | 11 विशेषतस्तेषामन्तर्व्वासी यः प्रीष्टस्यात्मा
प्रीष्टे वर्तिष्यमाणानि दुःभानि तदनुगामिप्रभावञ्च पूर्वं प्राकाशयत्
तेन कः कीदृशो वा समयो निरदिश्यतैतस्यानुसन्धानं कृतवन्तः | 12
ततस्तैर्विषयैस्ते यन्न स्वान् किन्त्वस्मान् उपकुर्वन्त्येतत् तेषां निकटे
प्राकाशयत् | यांश्च तान् विषयान् दिव्यदूता अभ्यवनतशिरसो निरीक्षितुम्
अभिलषन्ति ते विषयाः साम्प्रतं स्वर्गात् प्रेषितस्य पवित्रस्यात्मनः
सहाय्याद् युष्मत्समीपे सुसंवाद्यप्रयारयितृभिः प्राकाशयन्तः | 13 अतएव
यूयं मनःकटिबन्धनं कृत्वा प्रबुद्धाः सन्तो यीशुप्रीष्टस्य प्रकाशसमये
युष्मासु वर्तिष्यमानस्यानुग्रहस्य सम्पूर्णां प्रत्याशां कुरुत | 14 अपरं
पूर्व्याज्ञानतावस्थायाः कुत्सिताभिलाषाणां योग्यम् आचारं न कुर्वन्तो

યુષ્મદાહ્વાનકારી યથા પવિત્રો ડસ્તિ 15 યૂયમપ્યાજ્ઞાગ્રાહિસન્તાના ઇવ
 સર્વ્વસ્મિન્ આચારે તાદૃક્ પવિત્રા ભવત્ | 16 યતો લિખિતમ્ આસ્તે,
 યૂયં પવિત્રાસ્તિષ્ઠત યસ્માદ્દં પવિત્રઃ | 17 અપરઞ્ચ યો વિનાપક્ષપાતમ્
 એકૈકમાનુષસ્ય કર્માનુસારાદ્ વિચારં કરોતિ સ યદિ યુષ્માભિસ્તાત
 આપ્યાયતે તર્હિ સ્વપ્રવાસસ્ય કાલો યુષ્માભિ ભીંત્યા યાપ્યતાં | 18
 યૂયં નિરર્થકાત્ પૈતૃકાચારાત્ ક્ષયાણીયૈ રૂપ્યસુવર્ણાદિભિ મુક્તિં ન
 પ્રાપ્ય 19 નિષ્કલક્ટુનિર્મલમેષશાવકસ્યેવ પ્રીષ્ટસ્ય બહુમૂલ્યેન રુધિરેણ
 મુક્તિં પ્રાપ્તવન્ત ઇતિ જાનીથ | 20 સ જગતો ભિત્તિમૂલસ્થાપનાત્
 પૂર્વ્વં નિયુક્તઃ કિન્તુ ચરમદિનેષુ યુષ્મદર્થં પ્રકાશિતો ડભવત્ | 21
 યતસ્તેનૈવ મૃતગણાત્ તસ્યોત્થાપયિતરિ તસ્મૈ ગૌરવદાતરિ ચેશ્વરે
 વિશ્વસિથ તસ્માદ્ ઇશ્વરે યુષ્માકં વિશ્વાસઃ પ્રત્યાશા ચાસ્તે | 22 યૂયમ્
 આત્મના સત્યમતસ્યાજ્ઞાગ્રહણદ્વારા નિષ્કપટાય ભ્રાતૃપ્રેમ્ને પાવિતમનસો
 ભૂત્વા નિર્મલાન્તઃકરણૈઃ પરસ્પરં ગાઢં પ્રેમ કુરુત | 23 યસ્માદ્ યૂયં
 ક્ષયાણીયવીર્યાત્ નહિ કિન્ત્વક્ષયાણીયવીર્યાદ્ ઇશ્વરસ્ય જીવનદાયકેન
 નિત્યસ્થાયિના વાક્યેન પુનર્જન્મ ગૃહીતવન્તઃ | (aiōn g165) 24 સર્વ્વપ્રાણી
 તૃણૈસ્તુલ્યસ્તતેજસ્તૃણપુષ્પવત્ | તૃણાનિ પરિશુષ્યતિ પુષ્પાણિ નિપતન્તિ
 ચ | 25 કિન્તુ વાક્યં પરેશસ્યાનન્તકાલં વિતિષ્ઠતે | તદેવ ચ વાક્યં સુસંવાદેન
 યુષ્માકમ્ અન્તિકે પ્રકાશિતં | (aiōn g165)

2 સર્વ્વાન્ દ્વેષાન્ સર્વ્વાંશ્ચ છલાન્ કાપટ્યાનીર્ધ્યાઃ સમસ્તગ્લાનિકથાશ્ચ
 દૂરીકૃત્ય 2 યુષ્માભિઃ પરિત્રાણાય વૃદ્ધિપ્રાપ્ત્યર્થં નવજાતશિશુભિરિવ પ્રકૃતં
 વાગ્દુગ્ધં પિપાસ્યતાં | 3 યતઃ પ્રભુ મધુર એતસ્યાસ્વાદં યૂયં પ્રાપ્તવન્તઃ |
 4 અપરં માનુષૈરવજ્ઞાતસ્ય કિન્ત્વીશ્વરેણાભિરુચિતસ્ય બહુમૂલ્યસ્ય
 જીવત્પ્રસ્તરસ્યેવ તસ્ય પ્રભોઃ સન્નિધિમ્ આગતા 5 યૂયમપિ જીવત્પ્રસ્તરા
 ઇવ નિચીયમાના આત્મિકમન્દિરં પ્રીષ્ટેન ચીશુના ચેશ્વરતોષકાણામ્
 આત્મિકબલીનાં દાનાર્થં પવિત્રો યાજકવર્ગો ભવથ | 6 યતઃ શાસ્ત્રે
 લિખિતમાસ્તે, યથા, પશ્ય પાષાણ એકો ડસ્તિ સીયોનિ સ્થાપિતો મયા |
 મુખ્યકોણસ્ય યોગ્યઃ સ વૃતશ્રાતીવ મૂલ્યવાન્ | યો જનો વિશ્વસેત્
 તસ્મિન્ સ લજ્જાં ન ગમિષ્યતિ | 7 વિશ્વાસિનાં યુષ્માકમેવ સમીપે સ
 મૂલ્યવાન્ ભવતિ કિન્ત્વવિશ્વાસિનાં કૃતે નિચેતૃભિરવજ્ઞાતઃ સ પાષાણઃ

કોણસ્ય ભિન્નિમૂલં ભૂત્વા બાધાજનકઃ પાષાણઃ સ્ખલનકારકશ્ચ શૈલો
 જાતઃ | 8 તે ચાવિશ્વાસાદ્ વાક્યેન સ્ખલન્તિ સ્ખલને ચ નિયુક્તાઃ
 સન્તિ | 9 કિન્તુ યૂયં યેનાન્ધકારમધ્યાત્ સ્વકીયાશ્ચર્યદીપ્તિમધ્યમ્
 આહૂતાસ્તસ્ય ગુણાન્ પ્રકાશયિતુમ્ અભિરુચિતો વંશો રાજકીયો
 યાજકવર્ગઃ પવિત્રા જાતિરધિકર્ત્વ્યાઃ પ્રજાશ્ચ જાતાઃ | 10 પૂર્વ્વ યૂયં
 તસ્ય પ્રજા નાભવત કિન્તિવદાનીમ્ ઇશ્વરસ્ય પ્રજા આધ્વે | પૂર્વ્વમ્
 અનનુકમ્પિતા અભવત કિન્તિવદાનીમ્ અનુકમ્પિતા આધ્વે | 11 હે પ્રિયતમાઃ,
 યૂયં પ્રવાસિનો વિદેશિનશ્ચ લોકા ઇવ મનસઃ પ્રાતિકૂલ્યેન ચોધિભ્યઃ
 શારીરિકસુખાભિલાષેભ્યો નિવર્ત્તધ્વમ્ ઇત્યહં વિનયે | 12 દેવપૂજકાનાં મધ્યે
 યુષ્માકમ્ આચાર એવમ્ ઉત્તમો ભવતુ યથા તે યુષ્માન્ દુષ્કર્મકારિલોકાનિવ
 પુનર્ન નિન્દન્તઃ કૃપાદૃષ્ટિદિને સ્વચક્ષુર્ગોચરીયસત્ક્રિયાભ્ય ઇશ્વરસ્ય પ્રશંસાં
 કુર્યુઃ | 13 તતો હેતો યૂયં પ્રભોરનુરોધાત્ માનવસૃષ્ટાનાં કર્તૃત્વપદાનાં
 વશીભવત વિશેષતો ભૂપાલસ્ય યતઃ સ શ્રેષ્ઠઃ, 14 દેશાધ્યક્ષાણાઞ્ચ યતસ્તે
 દુષ્કર્મકારિણાં દાડદાનાર્થં સત્કર્મકારિણાં પ્રશંસાર્થઞ્ચ તેન પ્રેરિતાઃ |
 15 ઇત્યં નિબ્બૌધમાનુષાણામ્ અજ્ઞાનત્વં યત્ સદાચારિભિ ર્યુષ્માભિ
 નિરુત્તરીક્રિયતે તદ્ ઇશ્વરસ્યાભિમતં | 16 યૂયં સ્વાધીના ઇવાચરત તથાપિ
 દુષ્ટતાયા વેષસ્વરૂપાં સ્વાધીનતાં ધારયન્ત ઇવ નહિ કિન્તવીશ્વરસ્ય દાસા
 ઇવ | 17 સર્વાન્ સમાદ્રિયધ્વં ભ્રાતૃવર્ગે પ્રીયધ્વમ્ ઇશ્વરાદ્ બિભીત
 ભૂપાલં સમ્મન્યધ્વં | 18 હે દાસાઃ યૂયં સમ્પૂર્ણાદિરેણ પ્રભૂનાં વશ્યા ભવત
 કેવલં ભદ્રાણાં દયાલૂનાઞ્ચ નહિ કિન્તવનૃજૂનામપિ | 19 યતો ડન્યાયેન
 દુઃખભોગકાલ ઇશ્વરચિન્તયા યત્ કલેશસહનં તદેવ પ્રિયં | 20 પાપં કૃત્વા
 યુષ્માકં યપેટાઘાતસહનેન કા પ્રશંસા? કિન્તુ સદાચારં કૃત્વા યુષ્માકં યદ્
 દુઃખસહનં તદેવેશ્વરસ્ય પ્રિયં | 21 તદર્થમેવ યૂયમ્ આહૂતા યતઃ પ્રીષ્ઠોઽપિ
 યુષ્મન્નિમિત્તં દુઃખં ભુક્ત્વા યૂયં યત્ તસ્ય પદચિહ્નૈર્ પ્રજેત તદર્થં દૃષ્ટાન્તમેકં
 દર્શિતવાન્ | 22 સ કિમપિ પાપં ન કૃતવાન્ તસ્ય વદને કાપિ છલસ્ય કથા
 નાસીત્ | 23 નિન્દિતો ઽપિ સન્ સ પ્રતિનિન્દાં ન કૃતવાન્ દુઃખં સહમાનો
 ઽપિ ન ભર્ત્સિતવાન્ કિન્તુ યથાર્થવિચારયિતુઃ સમીપે સ્વં સમર્પિતવાન્ |
 24 વયં યત્ પાપેભ્યો નિવૃત્ય ધર્મ્માર્થં જીવામસ્તદર્થં સ સ્વશરીરેણાસ્માકં
 પાપાનિ કુશ ઊઠવાન્ તસ્ય પ્રહરૈ યૂયં સ્વસ્થા અભવત | 25 યતઃ પૂર્વ્વ યૂયં

ભ્રમણકારિમેષા ઇવાધ્વં કિન્તવધુના યુષ્માકમ્ આત્મનાં પાલકસ્યાધ્યક્ષસ્ય
ચ સમીપં પ્રત્યાવર્તિતાઃ |

૩ હે યોષિતઃ, યૂયમપિ નિજસ્વામિનાં વશ્યા ભવત તથા સતિ
યદિ કેચિદ્ વાક્યે વિશ્વાસિનો ન સન્તિ તર્હિ ૨ તે વિનાવાક્યં
યોષિતામ્ આચારેણાર્થતસ્તેષાં પ્રત્યક્ષેણ યુષ્માકં સભયસતીત્વાચારેણાક્રુષ્ટું
શક્ષ્યન્તે | ૩ અપરં કેશચનયા સ્વાર્ણલઙ્કારધારણોન પરિચ્છદપરિધાનેન
વા યુષ્માકં વાહ્યભૂષા ન ભવતુ, ૪ કિન્તવીશ્વરસ્ય સાક્ષાદ્
બહુમૂલ્યક્ષમાશાન્તિભાવાક્ષયરત્નેન યુક્તો ગુપ્ત આન્તરિકમાનવ એવ |
૫ યતઃ પૂર્વકાલે યાઃ પવિત્રસ્ત્રિય ઇશ્વરે પ્રત્યાશામકુર્વન્ તા અપિ
તાદૃશીમેવ ભૂષાં ધારયન્ત્યો નિજસ્વામિનાં વશ્યા અભવન્ | ૬ તથૈવ સારા
ઇબ્રાહીમો વશ્યા સતી તં પતિમાખ્યાતવતી યૂયઞ્ચ યદિ સદાચારિણ્યો
ભવથ વ્યાકુલતયા ચ ભીતા ન ભવથ તર્હિ તસ્યાઃ કન્યા આધ્વે | ૭ હે
પુરુષાઃ, યૂયં જ્ઞાનતો દુર્બલતરભાજનૈરિવ યોષિદ્ધિઃ સહવાસં કુરુત,
એકસ્ય જીવનવરસ્ય સહભાગિનીભ્યતાભ્યઃ સમાદરં વિતરત ચ ન ચેદ્
યુષ્માકં પ્રાર્થનાનાં બાધા જનિષ્યતે | ૮ વિશેષતો યૂયં સર્વ્વ એકમનસઃ
પરદુઃખૈઃ દુઃખિતા ભ્રાતૃપ્રમિણઃ કૃપાવન્તઃ પ્રીતિભાવાશ્ચ ભવત | ૯ અનિષ્ટસ્ય
પરિશોધેનાનિષ્ટં નિન્દાયા વા પરિશોધેન નિન્દાં ન કુર્વન્ત આશિષં દન્ત યતો
યૂયમ્ આશિરઘિકારિણો ભવિતુમાહૂતા ઇતિ જાનીથ | ૧૦ અપરઞ્ચ, જીવને
પ્રીયમાણો યઃ સુદિનાનિ દિદૃક્ષતે | પાપાત્ જિહ્વાં મૃષાવાક્યાત્ સ્વાધરૌ સ
નિવર્તયેત્ | ૧૧ સ ત્યજેદ્ દુષ્ટતામાર્ગં સત્ક્રિયાઞ્ચ સમાચરેત્ | મૃગયાણશ્ચ
શાન્તિં સ નિત્યમેવાનુધાવતુ | ૧૨ લોચને પરમેશસ્યોન્મીલિતે ધાર્મિકાન્
પ્રતિ | પ્રાર્થનાયાઃ કૃતે તેષાઃ તચ્છોત્રે સુગમે સદા | ક્રોધાસ્યઞ્ચ પરેશસ્ય
કદાચારિષુ વર્તતે | ૧૩ અપરં યદિ યૂયમ્ ઉત્તમસ્યાનુગામિનો ભવથ તર્હિ કો
યુષ્માન્ હિંસિષ્યતે? ૧૪ યદિ ચ ધર્મર્થ ક્લિશ્યધ્વં તર્હિ ધન્યા ભવિષ્યથ |
તેષામ્ આશક્રુયા યૂયં ન બિભીત ન વિડ્કત વા | ૧૫ મનોભિઃ કિન્તુ મન્યધ્વં
પવિત્રં પ્રભુમીશ્વરં | અપરઞ્ચ યુષ્માકમ્ આન્તરિકપ્રત્યાશાયાસ્તત્ત્વં યઃ
કશ્ચિત્ પૃચ્છતિ તસ્મૈ શાન્તિભીતિભ્યામ્ ઉત્તરં દાતું સદા સુસજ્જા ભવત |
૧૬ યે ચ પ્રીષ્ટધર્મં યુષ્માકં સદાચારં દૂષયન્તિ તે દુષ્કર્મકારિણામિવ યુષ્માકમ્
અપવાદેન યત્ લજ્જિતા ભવેયુસ્તદર્થ યુષ્માકમ્ ઉત્તમઃ સંવેદો ભવતુ | ૧૭

ઇશ્વરદત્તસામર્થ્યાદિવોપકરોતુ | સર્વવિષયે યીશુખ્રીષ્ટેનેશ્વરસ્ય ગૌરવં પ્રકાશ્યતાં તસ્યૈવ ગૌરવં પરાક્રમશ્ચ સર્વદા ભૂયાત્ | આમેન | (aīōn g165) 12 હે પ્રિયતમાઃ, યુષ્માકં પરીક્ષાર્થં યસ્તાપો યુષ્માસુ વર્તતે તમ્ અસમ્ભવઘટિતં મત્વા નાશ્ચર્યં જાનીત, 13 કિન્તુ ખ્રીષ્ટેન કલેશાનાં સહભાગિત્વાદ્ આનન્દત તેન તસ્ય પ્રતાપપ્રકાશેડપ્યાનનન્દેન પ્રકુલ્લા ભવિષ્યથ | 14 યદિ ખ્રીષ્ટસ્ય નામહેતુના યુષ્માકં નિન્દા ભવતિ તર્હિ યૂયં ધન્યા યતો ગૌરવદાયક ઇશ્વરસ્યાત્મા યુષ્માસ્વધિતિષ્ઠતિ તેષાં મધ્યે સ નિન્દતે કિન્તુ યુષ્મન્મધ્યે પ્રશંસ્યતે | 15 કિન્તુ યુષ્માકં કોડપિ હન્તા વા ચૈરો વા દુષ્કર્મકૃદ્ વા પરાધિકારચર્યક ઇવ દાણં ન ભુક્તાં | 16 યદિ ચ ખ્રીષ્ટીયાન ઇવ દાણં ભુક્તે તર્હિ સ ન લજ્જમાનસ્તત્કારણાદ્ ઇશ્વરં પ્રશંસતુ | 17 યતો વિચારસ્યારમ્ભસમયે ઇશ્વરસ્ય મન્દિરે યુજ્યતે યદિ ચાસ્મત્સ્વારભતે તર્હિશ્વરીયસુસંવાદાગ્રાહિણાં શેષદશા કા ભવિષ્યતિ? 18 ધાર્મિકેનાપિ ચેત્ ત્રાણમ્ અતિકૃચ્છ્રેણ ગમ્યતે | તર્હાધાર્મિકપાપિભ્યામ્ આશ્રયઃ કુત્ર લપ્સ્યતે | 19 અત ઇશ્વરેચ્છાતો યે દુઃખં ભુજ્જતે તે સદાચારેણ સ્વાત્માનો વિશ્વાસ્યસ્રષ્ટુરીશ્વસ્ય કરાભ્યાં નિદઘતાં |

5 ખ્રીષ્ટસ્ય કલેશાનાં સાક્ષી પ્રકાશિષ્યમાણસ્ય પ્રતાપસ્યાંશી પ્રાચીનશ્રાહં યુષ્માકં પ્રાચીનાન્ વિનીયેદં વદામિ | 2 યુષ્માકં મધ્યવર્તી ય ઇશ્વરસ્ય મેષવૃન્દો યૂયં તં પાલયત તસ્ય વીક્ષાણં કુરુત ચ, આવશ્યકત્વેન નહિ કિન્તુ સ્વેચ્છાતો ન વ કુલોભેન કિન્તિવચ્છુકમનસા | 3 અપરમ્ અંશાનામ્ અધિકારિણ ઇવ ન પ્રભવત કિન્તુ વૃન્દસ્ય દૃષ્ટાન્તસ્વરૂપા ભવત | 4 તેન પ્રધાનપાલક ઉપસ્થિતે યૂયમ્ અમ્લાનં ગૌરવકિરીટં લપ્સ્યધ્વે | 5 હે યુવાનઃ, યૂયમપિ પ્રાચીનલોકાનાં વશ્યા ભવત સર્વે ચ સર્વેષાં વશીભૂય નમ્રતાભરણેન ભૂષિતા ભવત, યતઃ, આત્માભિમાનિલોકાનાં વિપક્ષો ભવતીશ્વરઃ | કિન્તુ તેનૈવ નમ્રેભ્યઃ પ્રસાદાદ્ દીયતે વરઃ | 6 અતો યૂયમ્ ઇશ્વરસ્ય બલવત્કરસ્યાધો નમ્રીભૂય તિષ્ઠત તેન સ ઉચિતસમયે યુષ્માન્ ઉચ્ચીકરિષ્યતિ | 7 યૂયં સર્વચિન્તાં તસ્મિન્ નિક્ષિપત યતઃ સ યુષ્માન્ પ્રતિ ચિન્તયતિ | 8 યૂયં પ્રબુદ્ધા જાગ્રતશ્ચ તિષ્ઠત યતો યુષ્માકં પ્રતિવાદી યઃ શયતાનઃ સ ગજ્જર્જનકારી સિંહ ઇવ પર્યટન્ કં ગ્રસિષ્યામીતિ મૃગયતે, 9 અતો વિશ્વાસે સુસ્થિરાસ્તિષ્ઠન્તસ્તેન

સાહ્યં યુધ્યત, યુષ્માકં જગન્નિવાસિભ્રાતૃષ્વપિ તાદૃશાઃ કલેશા વર્તન્ત
 ઇતિ જાનીત | 10 ક્ષણિકદુઃખભોગાત્ પરમ્ અસ્મભ્યં ખ્રીષ્ટેન યીશુના
 સ્વકીયાનન્તગૌરવદાનાર્થં યોડસ્માન્ આહૂતવાન્ સ સર્વાનુગ્રાહીશ્વરઃ સ્વયં
 યુષ્માન્ સિદ્ધાન્ સ્થિરાન્ સબલાન્ નિશ્ચલાંશ્ચ કરોતુ | (aiōnios g166) 11
 તસ્ય ગૌરવં પરાક્રમશ્ચાનન્તકાલં યાવદ્ ભૂયાત્ | આમેન્ | (aiōn g165) 12
 યઃ સિલ્વાનો (મન્યે) યુષ્માકં વિશ્વાસ્યો ભ્રાતા ભવતિ તદ્વારાલં સંક્ષેપેણ
 લિખિત્વા યુષ્માન્ વિનીતવાન્ યૂયઞ્ચ યસ્મિન્ અધિતિષ્ઠથ સ એવેશ્વરસ્ય
 સત્યો ડનુગ્રહ ઇતિ પ્રમાણં દત્તવાન્ | 13 યુષ્માભિઃ સહાભિરુચિતા યા
 સમિતિ ભાંભિલિ વિદ્યતે સા મમ પુત્રો માર્કશ્ચ યુષ્માન્ નમસ્કારં વેદ્યતિ | 14
 યૂયં પ્રેમયુખ્મનેન પરસ્પરં નમસ્કુરુત | યીશુખ્રીષ્ટાશ્રિતાનાં યુષ્માકં સર્વેષાં
 શાન્તિ ભૂયાત્ | આમેન્ |

२ पितरः

1 ये जना अस्माभिः सार्द्धम् अस्तदीश्वरे त्रातरि यीशुप्रीष्टे य
पुण्यसम्बलितविश्वासधनस्य समानांशित्वं प्राप्तास्तान् प्रति यीशुप्रीष्टस्य
दासः प्रेरितश्च शिमोन् पितरः पत्रं लिभति। 2 एश्वरस्यास्माकं
प्रभो र्थीशोश्च तत्त्वज्ञानेन युष्मास्वनुग्रहशान्त्योर्बाहुल्यं वर्त्ततां। 3
जुवनार्थम् एश्वरभक्त्यर्थञ्च यद् आवश्यकं तत् सर्व्वं गौरवसद्गुणान्याम्
अस्मदाह्वानकारिणस्तत्त्वज्ञानद्वारा तस्येश्वरीयशक्तिरस्मत्स्यं दत्तवती।
4 तत्सर्व्वेषु यास्मत्स्यं तादृशा बहुमूल्या महाप्रतिज्ञा दत्ता
याभि र्यूयं संसारव्याप्तात् कुत्सिताभिलाषमूलात् सर्व्वनाशाद् रक्षां
प्राप्येश्वरीयस्वभावस्यांशिनो भवितुं शक्नुथ। 5 ततो हेतो र्यूयं
सम्पूर्णं यत्नं विधाय विश्वासे सौजन्यं सौजन्ये ज्ञानं 6 ज्ञान
आयतेन्द्रियताम् आयतेन्द्रियतायां धैर्य्यं धैर्य्यं एश्वरभक्तिम् 7 एश्वरभक्तौ
भ्रातृस्नेहे य प्रेम युङ्क्त। 8 अेतानि यद्वि युष्मासु विधन्ते वर्द्धन्ते य
तर्हस्यत्प्रभो र्थीशुप्रीष्टस्य तत्त्वज्ञाने युष्मान् अलसान् निष्कलांश्च न
स्थापयिष्यन्ति। 9 किन्वेतानि यस्य न विधन्ते सो ऽन्धो मुद्घितलोयनः
स्वकीयपूर्व्वपापानां माज्जनस्य विस्मृतिं गतश्च। 10 तस्माद् हे भ्रातरः, यूयं
स्वकीयाह्वानवराण्योर्दृढकरणे बहु यतध्वं, तत् कृत्वा कदाय न स्मलिष्यथ।
11 यतो ऽनेन प्रकारेणास्माकं प्रभोस्त्रातृ र्थीशुप्रीष्टस्यानन्तराज्यस्य
प्रवेशेन यूयं सुकलेन योजयिष्यध्वे। (aiōnios g166) 12 यद्यपि यूयम्
अेतत् सर्व्वं जानीथ वर्त्तमाने सत्यमते सुस्थिरा भवथ य तथापि
युष्मान् सर्व्वदा तत् स्मारयितुम् अहम् अयत्नवान् न भविष्यामि।
13 यावद् अेतस्मिन् दृष्ट्ये तिष्ठामि तावद् युष्मान् स्मारयन् प्रबोधयितुं
विहितं मन्ये। 14 यतो ऽस्माकं प्रभु र्थीशुप्रीष्टो मां यत् ज्ञापितवान्
तदनुसाराद् दृष्ट्यमेतत् मया शीघ्रं त्यक्तव्यम् एति जानामि। 15 मम
परलोकगमनात् परमपि यूयं यदेतानि स्मर्त्तुं शक्यथ तस्मिन् सर्व्वथा
यतिष्ये। 16 यतो ऽस्माकं प्रभो र्थीशुप्रीष्टस्य पराक्रमं पुनरागमनञ्च
युष्मान् ज्ञापयन्तो वयं कल्पितान्युपायानान्यन्वगच्छामेति नदि किन्तु तस्य
महिम्नः प्रत्यक्षसाक्षिणो भूत्वा भाषितवन्तः। 17 यतः स पितुरीश्वराद्
गौरवं प्रशंसाञ्च प्राप्तवान् विशेषतो महिमयुक्ततेजोमध्याद् अेतादृशी

वाणी तं प्रति निर्गतवती, यथा, अेष मम प्रियपुत्र अेतस्मिन् मम परमसन्तोषः। 18 स्वर्गात् निर्गतेयं वाणी पवित्रपर्वते तेन साद्धं विधमानैरस्माभिरश्रावि। 19 अपरम् अस्मत्समीपे दृढतरं भविष्यद्वाक्यं विधते यूयञ्च यदि दिनारम्भं युष्मन्मनःसु प्रभातीयनक्षत्रस्योदयञ्च यावत् तिमिरमये स्थाने ज्वलन्तं प्रदीपमिव तद् वाक्यं सम्मन्यध्वे तर्हि तद्रं करिष्यथ। 20 शास्त्रीयं किमपि भविष्यद्वाक्यं मनुष्यस्य स्वकीयभावबोधकं नडि, अेतद् युष्माभिः सम्यक् ज्ञायतां। 21 यतो भविष्यद्वाक्यं पुरा मानुषाणाम् ष्यतो नोत्पन्नं किन्त्वीश्वरस्य पवित्रलोकाः पवित्रेणात्मना प्रवर्तिताः सन्तो वाक्यम् अभाषन्त।

2 अपरं पूर्वकाले यथा लोकानां मध्ये मिथ्याभविष्यद्वादिन उपातिष्ठन् तथा युष्माकं मध्येऽपि मिथ्याशिक्षका उपस्थास्यन्ति, ते स्वेषां केतारं प्रभुम् अनङ्गीकृत्य सत्वरं विनाशं स्वेषु वर्तयन्ति विनाशकवैधर्म्यं गुप्तं युष्मन्मध्यम् आनेष्यन्ति। 2 ततो ऽनेकेषु तेषां विनाशकमार्गं गतेषु तेभ्यः सत्यमार्गस्य निन्दा सम्भविष्यति। 3 अपरञ्च ते लोभात् कापत्यवाक्यै र्युष्मत्तो लाभं करिष्यन्ते किन्तु तेषां पुरातनदण्डाज्ञा न विलम्बते तेषां विनाशश्च न निद्राति। 4 ष्यवरः कृतपापान् दूतान् न क्षमित्वा तिमिरशृङ्खलैः पाताले रुद्ध्वा विचारार्थं समर्पितवान्। (Tartarog 5020) 5 पुरातनं संसारमपि न क्षमित्वा तं दृष्टानां संसारं जलाप्लावनेन मज्जयित्वा सप्तजनैः सखितं धर्मप्रचारकं नोदं रक्षितवान्। 6 सिदोमम् अमोरा येतिनामके नगरे भविष्यतां दृष्टानां दृष्टान्तं विधाय तस्मीकृत्य विनाशेन दण्डितवान्; 7 किन्तु तैः कुत्सितव्यभियारिभि र्दृष्टात्मभिः क्लिष्टं धार्मिकं लोटं रक्षितवान्। 8 स धार्मिको जनस्तेषां मध्ये निवसन् स्वीयदृष्टिश्चोत्रगोयरेभ्यस्तेषाम् अधर्माचारेभ्यः स्वकीयधार्मिकमनसि दिने दिने तप्तवान्। 9 प्रभु र्भक्तान् परीक्षाद् उद्धर्तुं विचारदिनञ्च यावद् दण्डयामानान् अधार्मिकान् रोद्धुं पारयति, 10 विशेषतो ये ऽमेध्याभिलाषात् शारीरिकसुभम् अनुगच्छन्ति कर्तृत्वपदानि यावज्जानन्ति तानेव (रोद्धुं पारयति।) ते दुःसाहसिनः प्रगल्भाश्च। 11 अपरं बलगौरवाभ्यां श्रेष्ठा दिव्यदूताः प्रभोः सन्निधौ येषां वैपरीत्येन निन्दासूयकं विचारं न कुर्वन्ति तेषाम् उच्यपदस्थानां निन्दनाद् ष्ये न भीताः। 12 किन्तु ये बुद्धिहीनाः

प्रकृता जन्तवो धर्तव्यतायै विनाश्यतायै य जायन्ते तत्सदृशा एभे यन्न
 बुध्यन्ते तत् निन्दन्तः स्वकीयविनाश्यतया विनक्ष्यन्ति स्वीयाधर्मस्य
 इलं प्राप्स्यन्ति य। 13 ते दिवा प्रकृष्टभोजनं सुभं मन्यन्ते निजछलैः
 सुभभोगिनः सन्तो युष्माभिः सार्द्धं भोजनं कुर्वन्तः कलङ्किनो दोगिणश्च
 भवन्ति। 14 तेषां लोयनानि परदारकाङ्क्षीणि पापे याश्रान्तानि ते
 यत्रलानि मनांसि मोहयन्ति लोभे तत्परमनसः सन्ति य। 15 ते शापग्रस्ता
 वंशाः सरलमार्गं विहाय बियोरपुत्रस्य बिलियमस्य विपथेन व्रजन्तो
 भ्रान्ता अभवन्। स बिलियमो ऽध्यधर्मात् प्राप्ये पारितोषिकेऽप्रीयत,
 16 किन्तु निजापराधाद् भर्त्सनाम् अलभत यतो वयनशक्तिहीनं वाहनं
 मानुषिकगिरम् उच्यार्थं भविष्यद्वादिन उन्मत्तताम् अभाधत। 17
 एभे निर्जलानि प्रस्रवाणानि प्रयाऽवायुना यालिता भेधाश्च तेषां कृते
 नित्यस्थायी घोरतरान्धकारः सञ्चितो ऽस्ति। (questioned) 18 ये य जना
 भ्रान्त्यायारिगाणात् कृच्छ्रेणोद्धृतास्तान् एभे ऽपरिमितदर्पकथा भाषमाणाः
 शारीरिकसुभाभिलाषैः कामक्रीडाभिश्च मोहयन्ति। 19 तेभ्यः स्वाधीनतां
 प्रतिज्ञाय स्वयं विनाश्यताया दासा भवन्ति, यतः, यो येनैव पराजिग्ये
 स जातस्तस्य किङ्करः। 20 त्रातुः प्रभो र्यीशुप्रीष्टस्य ज्ञानेन संसारस्य
 मलेभ्य उद्धृता ये पुनस्तेषु निमज्ज्य पराजयन्ते तेषां प्रथमदशातः
 शेषदशा कुत्सिता भवति। 21 तेषां पक्षे धर्मपथस्य ज्ञानाप्राप्तिं वरं न य
 निर्दिष्टात् पवित्रविधिमार्गात् ज्ञानप्राप्तानां परावर्तनं। 22 किन्तु येयं सत्या
 दृष्टान्तकथा सैव तेषु इलितवती, यथा, कुङ्कुरः स्वीयवान्ताय व्यावर्तते पुनः
 पुनः। लुठितुं कर्दमे तद्धत् क्षालितश्चैव शूकरः।।

3 हे प्रियतमाः, यूनं यथा पवित्रभविष्यद्वक्तृभिः पूर्वोक्तानि वाक्यानि
 त्रात्रा प्रभुना प्रेरितानाम् अस्माकम् आदेशञ्च सारथ तथा युष्मान्
 स्मारयित्वा 2 युष्माकं सरलभावं प्रबोधयितुम् अहं द्वितीयम् एहं पत्रं
 लिभामि। 3 प्रथमं युष्माभिरिहं ज्ञायतां यत् शेषे काले स्वेच्छायारिणो
 निन्दका उपस्थाय 4 वदिष्यन्ति प्रभोरागमनस्य प्रतिज्ञा कुत्र? यतः
 पितृलोकानां महानिद्रागमनात् परं सर्वाणि सृष्टेरारम्भकाले यथा
 तथैवावतिष्ठन्ते। 5 पूर्वम् एश्वरस्य वाक्येनाकाशमाऽलं जलाद् उत्पन्ना
 जले सन्तिष्ठमाना य पृथिव्यविधतैतद् अनिच्छुकतातस्ते न जानन्ति,

6 ततस्तात्कालिकसंसारो जलेनाप्लावितो विनाशं गतः | 7 किन्त्वधुना
वर्तमाने आकाशभूमादले तेनैव वाक्येन वदन्यर्थं गुप्ते विचारदिनं
दृष्टमानवानां विनाशञ्च यावद् रक्ष्यते | 8 हे प्रियतमाः, यूयम् अंतर्देकं
वाक्यम् अनवगता मा भवत यत् प्रभोः साक्षाद् दिनमेकं वर्षसहस्रवद्
वर्षसहस्रञ्च दिनैकवत् | 9 केचिद् यथा विलम्बं मन्यन्ते तथा प्रभुः
स्वप्रतिज्ञायां विलम्बते तन्नाहि किन्तु कोऽपि यन्न विनश्येत् सर्व्वं अेव
मनःपरावर्तनं गच्छेयुरित्यभिलषन् सोऽस्मान् प्रति दीर्घसखिषण्डां
विदधाति | 10 किन्तु क्षपायां यौर एव प्रभो दिनम् आगमिष्यति तस्मिन्
महाशब्देन गगनमादलं लोप्यते मूलवस्तूनि य तापेन गलिष्यन्ते
पृथिवी तन्मध्यस्थितानि कर्माणि य धक्ष्यन्ते | 11 अतः सर्व्वैरेतैर्विकारे
गन्तव्ये सति यस्मिन् आकाशमादलं दाडेन विकारिष्यते मूलवस्तूनि य
तापेन गलिष्यन्ते 12 तस्येश्वरदिनस्यागमनं प्रतीक्षमाणैराकाङ्क्षमाणैश्च
युष्माभिर्धर्मायारेश्वरभक्तिभ्यां कीदृशैर्लोकैर्भवितव्यं? 13 तथापि वयं
तस्य प्रतिज्ञानुसारेण धर्मस्य वासस्थानं नूतनम् आकाशमादलं नूतनं
भूमादलञ्च प्रतीक्षामहे | 14 अतएव हे प्रियतमाः, तानि प्रतीक्षमाणा यूयं
निष्कलङ्का अनिन्दिताश्च भूत्वा यत् शान्त्याश्रितास्तिष्ठथैतस्मिन् यतध्वं |
15 अस्माकं प्रभो दीर्घसखिषण्डाञ्च परित्राणजनितां मन्यध्वं | अस्माकं
प्रियव्रात्रे पौलाय यत् ज्ञानम् अदायि तदनुसारेण सोऽपि पत्रे युष्मान् प्रति
तदेवालिभत् | 16 स्वकीयसर्व्वपत्रेषु यैतान्यधि प्रस्तुत्य तदेव गदति | तेषु
पत्रेषु कतिपयानि दृग्ग्राहि वाक्यानि विधन्ते ये य लोका अज्ञानाश्चलाश्च
ते निजविनाशार्थम् अन्यशास्त्रीयवयनानीव तान्यपि विकारयन्ति | 17
तस्माद् हे प्रियतमाः, यूयं पूर्व्वं बुद्ध्वा सावधानास्तिष्ठत, अधार्मिकाणां
ब्रान्तिश्रोतसापहताः स्वकीयसुस्थिरत्वात् मा ब्रश्यत | 18 किन्त्वस्माकं
प्रभोस्त्रातु र्थीशुश्रीष्टस्यानुग्रहे ज्ञाने य वद्ध्वं | तस्य गौरवम् एदानीं
सदाकालञ्च भूयात् | आमेन् | (aiōn g165)

૧ યોહન:

1 આદિતો ય આસીદ્ યસ્ય વાગ્ અસ્માભિરશ્રાવિ યત્ર વયં સ્વનેત્રૈ દૃષ્ટવન્તો યત્ર વીક્ષિતવન્તઃ સ્વકરૈઃ સ્પૃષ્ટવન્તશ્ચ તં જીવનવાદં વયં જ્ઞાપયામઃ | 2 સ જીવનસ્વરૂપઃ પ્રકાશત વયત્ર તં દૃષ્ટવન્તસ્તમધિ સાક્ષ્યં દદાશ્ચ, યશ્ચ પિતુઃ સન્નિધાવવર્તતાસ્માકં સમીપે પ્રકાશત ય તમ્ અનન્તજીવનસ્વરૂપં વયં યુષ્માન્ જ્ઞાપયામઃ | (aiōnios g166) 3 અસ્માભિ ર્યદ્ દૃષ્ટં શ્રુતત્ર તદેવ યુષ્માન્ જ્ઞાપ્યતે તેનાસ્માભિઃ સહાંશિત્વં યુષ્માકં ભવિષ્યતિ | અસ્માકત્ર સહાંશિત્વં પિત્રા તત્પુત્રેણ યીશુખ્રીષ્ટેન ય સાદ્ધ્ ભવતિ | 4 અપરત્ર યુષ્માકમ્ આનન્દો યત્ સમ્પૂર્ણો ભવેદ્ તદર્થં વયમ્ એતાનિ લિખામઃ | 5 વયં યાં વાર્તાં તસ્માત્ શ્રુત્વા યુષ્માન્ જ્ઞાપયામઃ સેયમ્ | ઈશ્વરો જ્યોતિસ્તસ્મિન્ અન્ધકારસ્ય લેશોડપિ નાસ્તિ | 6 વયં તેન સહાંશિન ઇતિ ગદિત્વા યધન્ધાકારે યરામસ્તર્હિ સત્યાચારિણો ન સન્તો ડનૃતવાદિનો ભવામઃ | 7 કિન્તુ સ યથા જ્યોતિષિ વર્તતે તથા વયમપિ યદિ જ્યોતિષિ યરામસ્તર્હિ પરસ્પરં સહભાગિનો ભવામસ્તસ્ય પુત્રસ્ય યીશુખ્રીષ્ટસ્ય રુધિરત્રાસ્માન્ સર્વસ્માત્ પાપાત્ શુદ્ધયતિ | 8 વયં નિષ્પાપા ઇતિ યદિ વદામસ્તર્હિ સ્વયમેવ સ્વાન્ વત્રયામઃ સત્યમતત્રાસ્માકમ્ અન્તરે ન વિધતે | 9 યદિ સ્વપાપાનિ સ્વીકુર્મ્મહે તર્હિ સ વિશ્વાસ્યો યાથાર્થિકશ્ચાસ્તિ તસ્માદ્ અસ્માકં પાપાનિ ક્ષમિષ્યતે સર્વસ્માદ્ અધર્માચ્યાસ્માન્ શુદ્ધયિષ્યતિ | 10 વયમ્ અકૃતપાપા ઇતિ યદિ વદામસ્તર્હિ તમ્ અનૃતવાદિનં કુર્મ્મસ્તસ્ય વાક્યત્રાસ્માકમ્ અન્તરે ન વિધતે |

2 હે પ્રિયબાલકાઃ, યુષ્માભિ ર્યત્ પાપં ન ક્રિયેત તદર્થં યુષ્માન્ પ્રત્યેતાનિ મયા લિખ્યન્તે | યદિ તુ કેનાપિ પાપં ક્રિયતે તર્હિ પિતુઃ સમીપે ડસ્માકં એકઃ સહાયો ડર્થતો ધાર્મિકો યીશુઃ ખ્રીષ્ટો વિધતે | 2 સ ચાસ્માકં પાપાનાં પ્રાયશ્ચિત્તં કેવલમસ્માકં નહિ કિન્તુ લિખિલસંસારસ્ય પાપાનાં પ્રાયશ્ચિત્તં | 3 વયં તં જાનીમ ઇતિ તદીયાજ્ઞાપાલનેનાવગચ્છામઃ | 4 અહં તં જાનામીતિ વદિત્વા યસ્તસ્યાજ્ઞા ન પાલયતિ સો ડનૃતવાદી સત્યમતત્ર તસ્યાન્તરે ન વિધતે | 5 યઃ કશ્ચિત્ તસ્ય વાક્યં પાલયતિ તસ્મિન્ ઈશ્વરસ્ય પ્રેમ સત્યરૂપેણ સિધ્યતિ વયં તસ્મિન્ વર્તામહે તદ્ એતેનાવગચ્છામઃ | 6 અહં તસ્મિન્ તિષ્ઠામીતિ યો ગદતિ તસ્યેદમ્ ઉચિતં યત્ ખ્રીષ્ટો યાદૃગ્ આચરિતવાન્ સો ડપિ તાદૃગ્

આચરેત્ | 7 હે પ્રિયતમાઃ, યુષ્માન્ પ્રત્યહં નૂતનામાઙ્ઞાં લિખામીતિ નહિ
 કિન્વાદિતો યુષ્માભિ લ્બધાં પુરાતનામાઙ્ઞાં લિખામિ | આદિતો યુષ્માભિ
 ર્યદ્ વાક્યં શ્રુતં સા પુરાતનાઙ્ઞા | 8 પુનરપિ યુષ્માન્ પ્રતિ નૂતનાઙ્ઞા મયા
 લિખ્યત એતદપિ તસ્મિન્ યુષ્માસુ ચ સત્યં, યતો ડન્ધકારો વ્યત્યેતિ સત્યા
 જ્યોતિશ્ચેદાનીં પ્રકાશતે; 9 અહં જ્યોતિષિ વર્ત ઇતિ ગદિત્વા યઃ સ્વભ્રાતરં
 દ્વેષ્ટિ સો ડધાપિ તમિસ્રે વર્તતે | 10 સ્વભ્રાતરિ યઃ પ્રીયતે સ એવ જ્યોતિષિ
 વર્તતે વિદ્મજનકં કિમપિ તસ્મિન્ ન વિદ્યતે | 11 કિન્તુ સ્વભ્રાતરં યો દ્વેષ્ટિ
 સ તિમિરે વર્તતે તિમિરે ચરતિ ચ તિમિરેણ ચ તસ્ય નયને ડન્ધીક્રિયેતે
 તસ્માત્ ક્ક યામીતિ સ ઙ્ઞાતું ન શક્નોતિ | 12 હે શિશવઃ, યૂયં તસ્ય નામ્ના
 પાપક્ષમાં પ્રાપ્તવન્તસ્તસ્માદ્ અહં યુષ્માન્ પ્રતિ લિખામિ | 13 હે પિતરઃ, ય
 આદિતો વર્તમાનસ્તં યૂયં જાનીથ તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખામિ | હે યુવાનઃ
 યૂયં પાપત્માનં જિતવન્તસ્તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખામિ | હે બાલકાઃ, યૂયં
 પિતરં જાનીથ તસ્માદ્ અહં યુષ્માન્ પ્રતિ લિખિતવાન્ | 14 હે પિતરઃ, આદિતો
 યો વર્તમાનસ્તં યૂયં જાનીથ તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખિતવાન્ | હે યુવાનઃ,
 યૂયં બલવન્ત આદ્યે, ઇશ્વરસ્ય વાક્યઞ્ચ યુષ્મદન્તરે વર્તતે પાપાત્મા ચ
 યુષ્માભિઃ પરાજિગ્યે તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખિતવાન્ | 15 યૂયં સંસારે
 સંસારસ્થવિષયેષુ ચ મા પ્રીયધ્વં યઃ સંસારે પ્રીયતે તસ્યાન્તરે પિતુઃ પ્રેમ ન
 તિષ્ઠતિ | 16 યતઃ સંસારે યદ્યત્ સ્થિતમ્ અર્થતઃ શારીરિકભાવસ્યાભિલાષો
 દર્શનેન્દ્રિયસ્યાભિલાષો જીવનસ્ય ગર્વ્યઞ્ચ સર્વમેતત્ પિતૃતો ન જાયતે કિન્તુ
 સંસારદેવ | 17 સંસારસ્તદીયાભિલાષઞ્ચ વ્યત્યેતિ કિન્તુ ય ઇશ્વરસ્યેષ્ટં
 કરોતિ સો ડન્નતકાલં યાવત્ તિષ્ઠતિ | (aiṅg g165) 18 હે બાલકાઃ,
 શેષકાલોડયં, અપરં ખ્રીષ્ટારિણોપસ્થાવ્યમિતિ યુષ્માભિ ર્યથા શ્રુતં તથા
 બહવઃ ખ્રીષ્ટારય ઉપસ્થિતાસ્તસ્માદ્યં શેષકાલોડસ્તીતિ વયં જાનીમઃ | 19
 તે ડસ્મન્મધ્યાન્ નિર્ગતવન્તઃ કિન્વસ્મદીયા નાસન્ યદ્યસ્મદીયા અભવિષ્યન્
 તર્હાસ્મત્સર્જે ડસ્થાસ્યન્, કિન્તુ સર્વે ડસ્મદીયા ન સન્ત્યેતસ્ય પ્રકાશ
 આવશ્યક આસીત્ | 20 યઃ પવિત્રસ્તસ્માદ્ યૂયમ્ અભિષેકં પ્રાપ્તવન્તસ્તેન
 સર્વાણિ જાનીથ | 21 યૂયં સત્યમતં ન જાનીથ તત્કારણાદ્ અહં યુષ્માન્ પ્રતિ
 લિખિતવાન્ તન્નહિ કિન્તુ યૂયં તત્ જાનીથ સત્યમતાચ્ચ કિમપ્યનૃતવાક્યં
 નોત્પદ્યતે તત્કારણાદેવ | 22 યીશુરભિષિક્તસ્ત્રાતેતિ યો નાઙ્ઞીકરોતિ તં

વિના કો ડપરો ડનૃતવાદી ભવેત્? સ એવ ખ્રીષ્ટારિ યઃ પિતરં પુત્રઞ્ચ નાઙ્ગીકરોતિ | 23 યઃ કશ્ચિત્ પુત્રં નાઙ્ગીકરોતિ સ પિતરમપિ ન ધારયતિ યશ્ચ પુત્રમઙ્ગીકરોતિ સ પિતરમપિ ધારયતિ | 24 આદિતો યુષ્માભિ ર્યત્ શ્રુતં તદ્ યુષ્માસુ તિષ્ઠતુ, આદિતઃ શ્રુતં વાક્યં યદિ યુષ્માસુ તિષ્ઠતિ, તર્હિ યૂયમપિ પુત્રે પિતરિ ચ સ્થાસ્યથ | 25 સ ય પ્રતિજ્ઞાયાસ્મભ્યં યત્ પ્રતિજ્ઞાતવાન્ તદ્ અનન્તજીવનં | (aiōnios g166) 26 યે જના યુષ્માન્ ભ્રામયન્તિ તાનધ્યહમ્ ઇદં લિખિતવાન્ | 27 અપરં યૂયં તસ્માદ્ યમ્ અભિષેકં પ્રાપ્તવન્તઃ સ યુષ્માસુ તિષ્ઠતિ તતઃ કોઽપિ યદ્ યુષ્માન્ શિક્ષયેત્ તદ્ અનાવશ્યકં, સ યાભિષેકો યુષ્માન્ સર્વાણિ શિક્ષયતિ સત્યશ્ચ ભવતિ ન યાતથ્યઃ, અતઃ સ યુષ્માન્ યદ્દદ્ અશિક્ષયત્ તદ્દત્ તત્ર સ્થાસ્યથ | 28 અતએવ હે પ્રિયબાલકા યૂયં તત્ર તિષ્ઠત, તથા સતિ સ યદા પ્રકાશિષ્યતે તદા વયં પ્રતિભાન્વિતા ભવિષ્યામઃ, તસ્યાગમનસમયે ચ તસ્ય સાક્ષાન્ન ત્રપિષ્યામહે | 29 સ ધાર્મિકો ડસ્તીતિ યદિ યૂયં જાનીથ તર્હિ યઃ કશ્ચિદ્ ધર્માચારં કરોતિ સ તસ્માત્ જાત ઇત્યપિ જાનીત |

3 પશ્યત વયમ્ ઇશ્વરસ્ય સન્તાના ઇતિ નામ્નાષ્યામહે, એતેન પિતાસ્મભ્યં કીદદ્ મહાપ્રેમ પ્રદત્તવાન્, કિન્તુ સંસારસ્તં નાજાનાત્ તત્કારણાદસ્માન્ અપિ ન જાનાતિ | 2 હે પ્રિયતમાઃ, ઇદાનીં વયમ્ ઇશ્વરસ્ય સન્તાના આસ્મહે પશ્યાત્ કિં ભવિષ્યામસ્તદ્ અધાપ્યપ્રકાશિતં કિન્તુ પ્રકાશં ગતે વયં તસ્ય સદૃશા ભવિષ્યામિ ઇતિ જાનીમઃ, યતઃ સ યાદૃશો ડસ્તિ તાદૃશો ડસ્માભિર્દર્શિષ્યતે | 3 તસ્મિન્ ઁષા પ્રત્યાશા યસ્ય કસ્યચિદ્ ભવતિ સ સ્વં તથા પવિત્રં કરોતિ યથા સ પવિત્રો ડસ્તિ | 4 યઃ કશ્ચિત્ પાપમ્ આચરતિ સ વ્યવસ્થાલક્ષ્ણં કરોતિ યતઃ પાપમેવ વ્યવસ્થાલક્ષ્ણં | 5 અપરં સો ડસ્માકં પાપાન્યપહર્તુ પ્રાકાશતૈતદ્ યૂયં જાનીથ, પાપઞ્ચ તસ્મિન્ ન વિધતે | 6 યઃ કશ્ચિત્ તસ્મિન્ તિષ્ઠતિ સ પાપાચારં ન કરોતિ યઃ કશ્ચિત્ પાપાચારં કરોતિ સ તં ન દૃષ્ટવાન્ ન વાવગતવાન્ | 7 હે પ્રિયબાલકાઃ, કશ્ચિદ્ યુષ્માકં ભ્રમં ન જનયેત્, યઃ કશ્ચિદ્ ધર્માચારં કરોતિ સ તાદૃગ્ ધાર્મિકો ભવતિ યાદૃક્ સ ધાર્મિકો ડસ્તિ | 8 યઃ પાપાચારં કરોતિ સ શયતાનાત્ જાતો યતઃ શયતાન આદિતઃ પાપાચારી શયતાનસ્ય કર્માણાં લોપાર્થમેવેશ્વરસ્ય પુત્રઃ પ્રાકાશત | 9 યઃ કશ્ચિદ્ ઇશ્વરાત્ જાતઃ સ પાપાચારં ન કરોતિ યતસ્તસ્ય

વીર્યં તસ્મિન્ તિષ્ઠતિ પાપાચારં કર્તુઞ્ચ ન શક્નોતિ યતઃ સ ઈશ્વરાત્ જાતઃ |
 10 ઇત્યનેનેશ્વરસ્ય સન્તાનાઃ શયતાનસ્ય ય સન્તાના વ્યક્તા ભવન્તિ | યઃ
 કશ્ચિદ્ ધર્માચારં ન કરોતિ સ ઈશ્વરાત્ જાતો નહિ યશ્ચ સ્વભ્રાતરિ ન પ્રીયતે
 સો ડપીશ્વરાત્ જાતો નહિ | 11 યતસ્તસ્ય ય આદેશ આદિતો યુષ્માભિઃ
 શ્રુતઃ સ એષ એવ યદ્ અસ્માભિઃ પરસ્પરં પ્રેમ કર્તવ્યં | 12 પાપાત્મતો
 જાતો યઃ કાબિલ્ સ્વભ્રાતરં હતવાન્ તત્સદૃશૈરસ્માભિર્ન ભવિતવ્યં | સ
 કસ્માત્ કારણાત્ તં હતવાન્? તસ્ય કર્માણિ દુષ્ટાણિ તદ્ભ્રાતુશ્ચ કર્માણિ
 ધર્માણ્યાસન્ ઇતિ કારણાત્ | 13 હે મમ ભ્રાતરઃ, સંસારો યદિ યુષ્માન્ દ્વેષ્ટિ
 તર્હિ તદ્ આશ્ચર્યં ન મન્યધ્વં | 14 વયં મૃત્યુમ્ ઉત્તીર્ય જીવનં પ્રાપ્તવન્તસ્તદ્
 ભ્રાતૃષુ પ્રેમકરણાત્ જાનીમઃ | ભ્રાતરિ યો ન પ્રીયતે સ મૃત્યૌ તિષ્ઠતિ |
 15 યઃ કશ્ચિત્ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સં નરઘાતી કિઞ્ચાનન્તજીવનં નરઘાતિનઃ
 કસ્યાપ્યન્તરે નાવતિષ્ઠતે તદ્ યૂયં જાનીથ | (aiṅīnios g166) 16 અસ્માકં કૃતે સ
 સ્વપ્રાણાસ્ત્યક્તવાન્ ઇત્યનેન વયં પ્રેમસ્તત્ત્વમ્ અવગતાઃ, અપરં ભ્રાતૃણાં
 કૃતે ડસ્માભિરપિ પ્રાણાસ્ત્યક્તવ્યાઃ | 17 સાંસારિકજીવિકાપ્રાપ્તો યો જનઃ
 સ્વભ્રાતરં દીનં દૃષ્ટ્વા તસ્માત્ સ્વીયદયાં રુણદ્ધિ તસ્યાન્તર ઈશ્વરસ્ય પ્રેમ કથં
 તિષ્ઠેત્? 18 હે મમ પ્રિયબાલકાઃ, વાક્યેન જિહ્વા વાસ્માભિઃ પ્રેમ ન કર્તવ્યં
 કિન્તુ કાર્યોણ સત્યતયા ચૈવ | 19 એતેન વયં યત્ સત્યમતસમ્બન્ધીયાસ્તત્
 જાનીમસ્તસ્ય સાક્ષાત્ સ્વાન્તઃકરણાણિ સાન્વયિતું શક્યામશ્ચ | 20 યતો
 ડસ્મદન્તઃકરણં યદ્ધસ્માન્ દૂષયતિ તર્હિસ્મદન્તઃ કરણાદ્ ઈશ્વરો મહાન્
 સર્વજ્ઞશ્ચ | 21 હે પ્રિયતમાઃ, અસ્મદન્તઃકરણં યદ્ધસ્માન્ ન દૂષયતિ તર્હિ
 વયમ્ ઈશ્વરસ્ય સાક્ષાત્ પ્રતિભાન્વિતા ભવામઃ | 22 યચ્ચ પ્રાર્થયામહે તત્
 તસ્માત્ પ્રાપ્નુમઃ, યતો વયં તસ્યાજ્ઞાઃ પાલયામસ્તસ્ય સાક્ષાત્ તુષ્ટિજનકમ્
 આચારં કુર્મશ્ચ | 23 અપરં તસ્યેયમાજ્ઞા યદ્ વયં પુત્રસ્ય યીશુષ્રીષ્ટસ્ય
 નામ્નિ વિશ્વસિમસ્તસ્યાજ્ઞાનુસારેણ ય પરસ્પરં પ્રેમ કુર્મઃ | 24 યશ્ચ
 તસ્યાજ્ઞાઃ પાલયતિ સ તસ્મિન્ તિષ્ઠતિ તસ્મિન્ સોડપિ તિષ્ઠતિ; સ યાસ્માન્
 યમ્ આત્માનં દત્તવાન્ તસ્માત્ સો ડસ્માસુ તિષ્ઠતીતિ જાનીમઃ |

4 હે પ્રિયતમાઃ, યૂયં સર્વોષ્વાત્મસુ ન વિશ્વસિત કિન્તુ તે ઈશ્વરાત્ જાતા
 ન વેત્યાત્મનઃ પરીક્ષધ્વં યતો બહવો મૃષાભવિષ્યદ્વાદિનો જગન્મધ્યમ્
 આગતવન્તઃ | 2 ઈશ્વરીયો ય આત્મા સ યુષ્માભિરનેન પરિચીયતાં,

યીશુઃ પ્રીયો નરાવતારો ભૂત્વાગત એતદ્ યેન કેનચિદ્ આત્મના સ્વીક્રિયતે
 સ ઈશ્વરીયઃ | 3 કિન્તુ યીશુઃ પ્રીયો નરાવતારો ભૂત્વાગત એતદ્ યેન
 કેનચિદ્ આત્મના નાઙ્ગીક્રિયતે સ ઈશ્વરીયો નહિ કિન્તુ પ્રીષ્ટારેરાત્મા, તેન
 યાગન્તવ્યમિતિ યુષ્માભિઃ શ્રુતં, સ ચેદાનીમપિ જગતિ વર્તતે | 4 હે બાલકાઃ,
 યૂયમ્ ઈશ્વરાત્ જાતાસ્તાન્ જિતવન્તશ્ચ યતઃ સંસારાધિષ્ઠાનકારિણો ડપિ
 યુષ્મદધિષ્ઠાનકારી મહાન્ | 5 તે સંસારાત્ જાતાસ્તતો હેતોઃ સંસારાદ્ ભાષન્તે
 સંસારશ્ચ તેષાં વાક્યાનિ ગૃહ્ણાતિ | 6 વયમ્ ઈશ્વરાત્ જાતાઃ, ઈશ્વરં યો
 જાનાતિ સોડસ્મદ્વાક્યાનિ ગૃહ્ણાતિ યશ્ચેશ્વરાત્ જાતો નહિ સોડસ્મદ્વાક્યાનિ
 ન ગૃહ્ણાતિ; અનેન વયં સત્યાત્માનં ભ્રામકાત્માનઞ્ચ પરિચિનુમઃ | 7 હે
 પ્રિયતમાઃ, વયં પરસ્પરં પ્રેમ કરવામ, યતઃ પ્રેમ ઈશ્વરાત્ જાયતે, અપરં યઃ
 કશ્ચિત્ પ્રેમ કરોતિ સ ઈશ્વરાત્ જાત ઈશ્વરં વેત્તિ ય | 8 યઃ પ્રેમ ન કરોતિ
 સ ઈશ્વરં ન જાનાતિ યત ઈશ્વરઃ પ્રેમસ્વરૂપઃ | 9 અસ્માસ્વીશ્વરસ્ય પ્રેમૈતેન
 પ્રાકાશત યત્ સ્વપુત્રેણાસ્મભ્યં જીવનદાનાર્થમ્ ઈશ્વરઃ સ્વીયમ્ અદ્વિતીયં
 પુત્રં જગન્મધ્યં પ્રેષિતવાન્ | 10 વયં યદ્ ઈશ્વરે પ્રીતવન્ત ઇત્યત્ર નહિ કિન્તુ
 સ યદસ્માસુ પ્રીતવાન્ અસ્મત્યાપાનાં પ્રાયશ્ચિત્તાર્થં સ્વપુત્રં પ્રેષિતવાંશ્ચેત્યત્ર
 પ્રેમ સન્તિષ્ઠતે | 11 હે પ્રિયતમાઃ, અસ્માસુ યદીશ્વરેણૈતાદૃશં પ્રેમ કૃતં
 તર્હિ પરસ્પરં પ્રેમ કર્તુમ્ અસ્માકમપ્યુચિતં | 12 ઈશ્વરઃ કદાચ કેનાપિ
 ન દૃષ્ટઃ યદ્ધસ્માભિઃ પરસ્પરં પ્રેમ ક્રિયતે તર્હીશ્વરો ડસ્મન્મધ્યે તિષ્ઠતિ
 તસ્ય પ્રેમ યાસ્માસુ સેત્સ્યતે | 13 અસ્મભ્યં તેન સ્વકીયાત્મનોડશો દત્ત
 ઇત્યનેન વયં યત્ તસ્મિન્ તિષ્ઠામઃ સ ય યદ્ અસ્માસુ તિષ્ઠતીતિ જાનીમઃ |
 14 પિતા જગત્રાતારં પુત્રં પ્રેષિતવાન્ એતદ્ વયં દૃષ્ટ્વા પ્રમાણયામઃ | 15
 યીશુરીશ્વરસ્ય પુત્ર એતદ્ યેનાઙ્ગીક્રિયતે તસ્મિન્ ઈશ્વરસ્તિષ્ઠતિ સ ચેશ્વરે
 તિષ્ઠતિ | 16 અસ્માસ્વીશ્વરસ્ય યત્ પ્રેમ વર્તતે તદ્ વયં જ્ઞાતવન્તસ્તસ્મિન્
 વિશ્વાસિતવન્તશ્ચ | ઈશ્વરઃ પ્રેમસ્વરૂપઃ પ્રેમ્ની યસ્તિષ્ઠતિ સ ઈશ્વરે
 તિષ્ઠતિ તસ્મિંશ્ચેશ્વરસ્તિષ્ઠતિ | 17 સ યાદૃશો ડસ્તિ વયમપ્યેતસ્મિન્
 જગતિ તાદૃશા ભવામ એતસ્માદ્ વિચારદિને ડસ્માભિ ર્યા પ્રતિભા લભ્યતે
 સાસ્મત્સમ્બન્ધીયસ્ય પ્રેમ્નઃ સિદ્ધિઃ | 18 પ્રેમ્નિ ભીતિ ન વર્તતે કિન્તુ સિદ્ધં
 પ્રેમ ભીતિ નિરાકરોતિ યતો ભીતિઃ સયાતનાસ્તિ ભીતો માનવઃ પ્રેમ્નિ સિદ્ધો
 ન જાતઃ | 19 અસ્માસુ સ પ્રથમં પ્રીતવાન્ ઇતિ કારણાદ્ વયં તસ્મિન્

પ્રીયામહે | 20 ઈશ્વરે ડહં પ્રીય ઇત્યુક્ત્વા યઃ કશ્ચિત્ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સો ડનૃતવાદી | સ યં દૃષ્ટવાન્ તસ્મિન્ સ્વભ્રાતરિ યદિ ન પ્રીયતે તર્હિ યમ્ ઈશ્વરં ન દૃષ્ટવાન્ કથં તસ્મિન્ પ્રેમ કર્તુ શક્નુયાત્? 21 અત ઈશ્વરે યઃ પ્રીયતે સ સ્વીયભ્રાતર્યપિ પ્રીયતામ્ ઇયમ્ આજ્ઞા તસ્માદ્ અસ્માભિ લ્બધા |

5 યીશુરભિષિક્તસ્ત્રાતેતિ યઃ કશ્ચિદ્ વિશ્વાસિતિ સ ઈશ્વરાત્ જાતઃ; અપરં યઃ કશ્ચિત્ જનયિતરિ પ્રીયતે સ તસ્માત્ જાતે જને ડપિ પ્રીયતે | 2 વયમ્ ઈશ્વરસ્ય સન્તાનેષુ પ્રીયામહે તદ્ અનેન જાનીમો યદ્ ઈશ્વરે પ્રીયામહે તસ્યાજ્ઞાઃ પાલયામશ્ચ | 3 યત ઈશ્વરે યત્ પ્રેમ તત્ તદીયાજ્ઞાપાલનેનાસ્માભિઃ પ્રકાશયિતવ્યં, તસ્યાજ્ઞાશ્ચ કઠોરા ન ભવન્તિ | 4 યતો યઃ કશ્ચિદ્ ઈશ્વરાત્ જાતઃ સ સંસારં જયતિ કિઞ્ચાસ્માકં યો વિશ્વાસઃ સ એવાસ્માકં સંસારજયિજયઃ | 5 યીશુરીશ્વરસ્ય પુત્ર ઇતિ યો વિશ્વસિતિ તં વિના કોડપરઃ સંસારં જયતિ? 6 સોડભિષિક્તસ્ત્રાતા યીશુસ્તોયરુધિરાભ્યામ્ આગતઃ કેવલં તોયેન નહિ કિન્તુ તોયરુધિરાભ્યામ્ આત્મા ય સાક્ષી ભવતિ યત આત્મા સત્યતાસ્વરૂપઃ | 7 યતો હેતોઃ સ્વર્ગે પિતા વાદઃ પવિત્ર આત્મા ય ત્રય ઇમે સાક્ષિણઃ સન્તિ, ત્રય ઇમે ચૈકો ભવન્તિ | 8 તથા પૃથિવ્યામ્ આત્મા તોયં રુધિરઞ્ચ ત્રીણ્યેતાનિ સાક્ષ્યં દદાતિ તેષાં ત્રયાણામ્ એકત્વં ભવતિ ય | 9 માનવાનાં સાક્ષ્યં યદસ્માભિ ગૃહ્યતે તર્હીશ્વરસ્ય સાક્ષ્યં તસ્માદપિ શ્રેષ્ઠં યતઃ સ્વપુત્રમધીશ્વરેણ દત્તં સાક્ષ્યમિદં | 10 ઈશ્વરસ્ય પુત્રે યો વિશ્વાસિતિ સ નિજાન્તરે તત્ સાક્ષ્યં ધારયતિ; ઈશ્વરે યો ન વિશ્વસિતિ સ તમ્ અનૃતવાદિનં કરોતિ યત ઈશ્વરઃ સ્વપુત્રમધિ યત્ સાક્ષ્યં દત્તવાન્ તસ્મિન્ સ ન વિશ્વસિતિ | 11 તસ્ય સાક્ષ્યમિદં યદ્ ઈશ્વરો ડસ્મભ્યમ્ અનન્તજીવનં દત્તવાન્ તસ્ય જીવનં તસ્ય પુત્રે વિદ્યતે | (aiōnios g166) 12 યઃ પુત્રં ધારયતિ સ જીવનં ધારિયતિ, ઈશ્વરસ્ય પુત્રં યો ન ધારયતિ સ જીવનં ન ધારયતિ | 13 ઈશ્વરપુત્રસ્ય નાભિ યુષ્માન્ પ્રત્યેતાનિ મયા લિખિતાનિ તસ્યાભિપ્રાયો ડયં યદ્ યૂયમ્ અનન્તજીવનપ્રાપ્તા ઇતિ જાનીયાત તસ્યેશ્વરપુત્રસ્ય નાભિ વિશ્વસેત ય | (aiōnios g166) 14 તસ્યાન્તિકે ડસ્માકં યા પ્રતિભા ભવતિ તસ્યાઃ કારણમિદં યદ્ વયં યદિ તસ્યાભિમતં કિમપિ તં યાચામહે તર્હિ સો ડસ્માકં વાક્યં શૃણોતિ | 15 સ ચાસ્માકં યત્ કિઞ્ચન યાયનં શૃણોતીતિ યદિ જાનીમસ્તર્હિ

તસ્માદ્ યાચિતા વરા અસ્માભિઃ પ્રાપ્યન્તે તદપિ જાનીમઃ | 16 કશ્ચિદ્
 યદિ સ્વભ્રાતરમ્ અમૃત્યુજનકં પાપં કુર્વન્તં પશ્યતિ તર્હિ સ પ્રાર્થનાં કરોતુ
 તેનેશ્વરસ્તસ્મૈ જીવનં દાસ્યતિ, અર્થતો મૃત્યુજનકં પાપં યેન નાકારિતસ્મૈ |
 કિન્તુ મૃત્યુજનકમ્ એકં પાપમ્ આસ્તે તદધિ તેન પ્રાર્થના ક્રિયતામિત્યહં ન
 વદામિ | 17 સર્વ્ય એવાધર્મઃ પાપં કિન્તુ સર્વ્યપાપં મૃત્યુજનકં નહિ | 18 ય
 ઈશ્વરાત્ જાતઃ સ પાપાયારં ન કરોતિ કિન્ત્વીશ્વરાત્ જાતો જનઃ સ્વં રક્ષતિ
 તસ્માત્ સ પાપાત્મા તં ન સ્પૃશતીતિ વયં જાનીમઃ | 19 વયમ્ ઈશ્વરાત્
 જાતાઃ કિન્તુ કૃત્સનઃ સંસારઃ પાપાત્મનો વશં ગતો ડસ્તીતિ જાનીમઃ |
 20 અપરમ્ ઈશ્વરસ્ય પુત્ર આગતવાન્ વયઞ્ચ યયા તસ્ય સત્યમયસ્ય
 જ્ઞાનં પ્રાપ્નુયામસ્તાદૃશીં ધિયમ્ અસ્મભ્યં દત્તવાન્ ઇતિ જાનીમસ્તસ્મિન્
 સત્યમયે ડર્થતસ્તસ્ય પુત્રે યીશુપ્રીષ્ટે તિષ્ઠામશ્ચ; સ એવ સત્યમય ઈશ્વરો
 ડનન્તજીવનસ્વરૂપશ્ચાસ્તિ | (aiōnios g166) 21 હે પ્રિયબાલકાઃ, યૂયં
 દેવમૂર્તિભ્યઃ સ્વાન્ રક્ષત | આમેન્ |

२ योडनः

1 हे अभिरुचिरे कुरिये, त्वां तव पुत्रांश्च प्रति प्राचीनोऽहं पत्रं लिखामि |
2 सत्यमताद् युष्मासु मम प्रेमास्ति केवलं मम नहि किन्तु सत्यमतज्ञानां
सर्वेषामेव | यतः सत्यमतम् अस्मासु तिष्ठत्यनन्तकालं यावद्यास्मासु
स्थास्यति | (aiōn g165) 3 पितुरीश्वरात् तत्पितुः पुत्रात् प्रभो र्यीशुप्रीष्टाय
प्राप्यो ऽनुग्रहः कृपा शान्तिश्च सत्यताप्रेमभ्यां सार्द्धं युष्मान् अधितिष्ठतु |
4 वयं पितृतो याम् आज्ञां प्राप्तवन्तस्तदनुसारेण तव केचिद् आत्मजाः
सत्यमतम् आयन्त्येतस्य प्रमाणां प्राप्याहं भृशम् आनन्दितवान् | 5
साम्प्रतञ्च हे कुरिये, नवीनां काञ्चिद् आज्ञां न लिखन्नाहम् आदितो लब्धाम्
आज्ञां लिखन् त्वाम् एतं विनये यद् अस्माभिः परस्परं प्रेम कर्तव्यं | 6
अपरं प्रेमैतेन प्रकाशते यद् वयं तस्याज्ञा आयरेम | आदितो युष्माभि र्या
श्रुता सेयम् आज्ञा सा य युष्माभिरायरितव्या | 7 यतो बहवः प्रवञ्चका
जगत् प्रविश्य यीशुप्रीष्टो नरावतारो भूत्वागत एतत् नाङ्गीकुर्वन्ति स एव
प्रवञ्चकः प्रीष्टारिश्चास्ति | 8 अस्माकं भ्रमो यत् पण्डितो न भवेत् किन्तु
सम्पूर्णं वेतनमस्माभि र्लभ्येत तदर्थं स्वानधि सावधाना भवतः | 9 यः
कश्चिद् विपथगामी भूत्वा प्रीष्टस्य शिक्षायां न तिष्ठति स एश्वरं न धारयति
प्रीष्टस्य शिक्षायां यस्तिष्ठति स पितरं पुत्रञ्च धारयति | 10 यः कश्चिद्
युष्मत्सन्निधिमागच्छन् शिक्षामेनां नानयति स युष्माभिः स्ववेश्मनि न
गृह्यतां तव मङ्गलं भूयादिति वागपि तस्मै न कथ्यतां | 11 यतस्तव मङ्गलं
भूयादिति वायं यः कश्चित् तस्मै कथयति स तस्य दुष्कर्माणाम् अंशी
भवति | 12 युष्मान् प्रति मया बहूनि लेखितव्यानि किन्तु पत्रमसीत्त्यां
तत् कर्तुं नेच्छामि, यतो ऽस्माकम् आनन्दो यथा सम्पूर्णो भविष्यति
तथा युष्मत्समीपमुपस्थायाहं सम्भुभीभूय युष्माभिः सम्भाषिष्ये इति
प्रत्याशा ममास्ते | 13 तवाभिरुचिताया भगिन्या बालकास्त्वां नमस्कारं
ज्ञापयन्ति | आमेन् |

3 योडनः

1 प्रायीनो ऽहं सत्यमताद् यस्मिन् प्रीये तं प्रियतमं गायं प्रति पत्रं लिखामि। 2 हे प्रिय, तवात्मा यादृक् शुभान्वितस्तादृक् सर्वविषये तव शुभं स्वास्थ्यञ्च भूयात्। 3 भ्रातृभिरागत्य तव सत्यमतस्यार्थतस्त्वं कीदृक् सत्यमतमायरस्येतस्य साक्ष्ये दत्ते मम मडानन्दो जातः। 4 मम सन्तानाः सत्यमतमायरन्तीतिवार्तातो मम य आनन्दो जायते ततो मत्तरो नास्ति। 5 हे प्रिय, भ्रातृन् प्रति विशेषतस्तान् विदेशिनो भृतृन् प्रति त्वया यद्यत् कृतं तत् सर्वं विश्वासिनो योग्यं। 6 ते य समितेः साक्षात् तव प्रभः प्रमाणं दत्तवन्तः, अपरम् ईश्वरयोग्यरूपेण तान् प्रस्थापयता त्वया सत्कर्म्म कारिष्यते। 7 यतस्ते तस्य नाम्ना यात्रां विधाय भिन्नजातीयेभ्यः किमपि न गृहीतवन्तः। 8 तस्माद् वयं यत् सत्यमतस्य सहाया भवेम तदर्थमेतादृशा लोका अस्माभिरनुगृहीतव्याः। 9 समितिं प्रत्यहं पत्रं लिखितवान् किन्तु तेषां मध्ये यो द्वियत्रिङ्गिः प्रधानायते सो ऽस्मान् न गृह्णाति। 10 अतो ऽहं यद्योपस्थास्यामि तदा तेन यद्यत् क्रियते तत् सर्वं तं स्मारयिष्यामि, यतः स दुर्व्याक्यैरस्मान् अपवदति, तेनापि तृप्तिं न गत्वा स्वयमपि भ्रातृन् नानुगृह्णाति ये यानुगृहीतुमिच्छन्ति तान् समितितो ऽपि बहिष्करोति। 11 हे प्रिय, त्वया दुष्कर्म्म नानुक्रियतां किन्तु सत्कर्म्भेव। यः सत्कर्म्मायारी स ईश्वरात् जातः, यो दुष्कर्म्मायारी स ईश्वरं न दृष्टवान्। 12 दीभीत्रियस्य पक्षे सर्वैः साक्ष्यम् अदायि विशेषतः सत्यमतेनापि, वयमपि तत्पक्षे साक्ष्यं ददाः, अस्माकञ्च साक्ष्यं सत्यमेवेति यूयं जानीथ। 13 त्वां प्रति मया बहूनि लेखितव्यानि किन्तु मसीलोभनीभ्यां लेखितुं नेच्छामि। 14 अथिरेण त्वां द्रक्ष्यामीति मम प्रत्याशास्ते तदावां सम्भुजीभूय परस्परं सम्भाषिष्यावडे। तव शान्तिं भूयात्। अस्माकं मित्राणि त्वां नमस्कारं ज्ञापयन्ति त्वमप्येकैकस्य नाम प्रोच्य मित्रेभ्यो नमस्करु। एति।

यिडूदाः

1 यीशुश्रीष्टस्य दासो याकूबो ब्राता यिडूदास्तातेनेश्वरेण पवित्रीकृतान् यीशुश्रीष्टेन रक्षितांश्चाडूतान् लोकान् प्रति पत्रं लिभति | 2 कृपा शान्तिः प्रेम य आडुल्यरूपेण युष्मास्वधितिष्ठतु | 3 हे प्रियाः, साधारणपरित्राणमधि युष्मान् प्रति लेभितुं मम अडुयत्ने जाते पूर्वकाले पवित्रलोकेषु समर्पितो यो धर्मस्तदर्थं यूयं प्राणव्ययेनापि सयेष्टा भवतेति विनयार्थं युष्मान् प्रति पत्रलेभनमावश्यकम् अमन्ये | 4 यस्माद् अतद्रूपदण्डप्राप्तये पूर्वं लिभिताः केचिज्जना अस्मान् उपसृतवन्तः, ते ऽधार्मिकलोका अस्माकम् एश्वरस्यानुग्रहं ध्वञ्जित्य लम्पटताम् आयरन्ति, अद्वितीयो ऽधिपति र्यो ऽस्माकं प्रभु र्यीशुश्रीष्टस्तं नाङ्गीकुर्वन्ति | 5 तस्माद् यूयं पुरा यद् अवगतास्तत् पुन युष्मान् स्मारयितुम् एच्छामि, इलतः प्रभुरेककृत्यः स्वप्राजा मिसरदेशाद् उदधार यत् ततः परम् अविश्वासिनो व्यनाशयत् | 6 ये य स्वर्गदूताः स्वीयकर्तृत्वपदे न स्थित्वा स्ववासस्थानं परित्यक्तवन्तस्तान् स महादिनस्य विचारार्थम् अन्धकारमये ऽधःस्थाने सदास्थायिभि र्बन्धनैरबध्नात् | (aīdios g126) 7 अपरं सिदोमम् अमोरा तन्निकटस्थनगराणि यैतेषां निवासिनस्तत्समरूपं व्यभियारं कृतवन्तो विषममैथुनस्य येष्टया विपथं गतवन्तश्च तस्मात् तान्यपि दृष्टान्तस्वरूपाणि भूत्वा सदातनवह्निना दण्डं भुञ्जते | (aīōnios g166) 8 तथैवेमे स्वभाचारिणोऽपि स्वशरीराणि कलङ्कयन्ति राजाधीनतां न स्वीकुर्वन्त्युच्यपदस्थान् निन्दन्ति य | 9 किन्तु प्रधानदिव्यदूतो भीभायेलो यदा मूससो देहे शयतानेन विवदमानः समभाषत तदा तिस्मन् निन्दारूपं दण्डं समर्पयितुं साडसं न कृत्वाकथयत् प्रभुस्त्वां भर्त्सयतां | 10 किन्त्वमे यन्न बुध्यन्ते तन्निन्दन्ति यय्य निब्वोधपशव एवेन्द्रियैरवगच्छन्ति तेन नश्यन्ति | 11 तान् धिक्, ते काबिलो मार्गे यरन्ति पारितोषिकस्याशातो बिलियमो ब्रान्तिमनुधावन्ति कोरडस्य दुर्भुभत्वेन विनश्यन्ति य | 12 युष्माकं प्रेमभोज्येषु ते विघ्नजनका भवन्ति, आत्मभ्रमरयश्च भूत्वा निर्लज्जया युष्माभिः सार्द्धं भुञ्जते | ते वायुभिश्चालिता निस्तोयमेघा लेभन्तकालिका निष्कला द्वि र्भृता उन्भूलिता वृक्षाः, 13 स्वकीयलज्जार्केशोद्धमकाः प्रयाण्डाः सामुद्रतरङ्गाः

सदाकालं यावत् घोरतिमिरभागीनि भ्रमणकारीणि नक्षत्राणि य भवन्ति।
 (aiōn g165) 14 आद्यमतः सप्तमः पुरुषो यो हनोकः स तानुद्दिश्य
 भविष्यद्वाक्यमिदं कथितवान्, यथा, पश्य स्वकीयपुण्यानाम् अयुतै
 र्वैष्टितः प्रभुः। 15 सर्वान् प्रति विचाराज्ञासाधनायागमिष्यति। तदा
 याधार्मिकाः सर्वे जाता यैरपराधिनः। विधर्मकर्माणां तेषां सर्वेषामेव
 कारणात्। तथा तद्वैपरीत्येनाप्यधर्माचारिणापिनां। उक्तकठोरवाक्यानां
 सर्वेषामपि कारणात्। परमेशेन द्रोषित्वं तेषां प्रकाशयिष्यते। 16 ते
 वाक्कलङ्कारिणः स्वभाष्यनिन्दकाः स्वेच्छाचारिणो दर्पवादिभुविशिष्टा
 लाभार्थं मनुष्यस्तावकाश्च सन्ति। 17 किन्तु हे प्रियतमाः, अस्माकं प्रभो
 र्यीशुप्रीष्टस्य प्रेरितै र्यद् वाक्यं पूर्व्यं युष्मभ्यं कथितं तत् स्मरत, 18 इलतः
 शेषसमये स्वेच्छातो ऽधर्माचारिणो निन्दका उपस्थास्यन्तीति। 19 अते
 लोकाः स्वान् पृथक् कुर्वन्तः सांसारिका आत्महीनाश्च सन्ति। 20 किन्तु हे
 प्रियतमाः, यूयं स्वेषाम् अतिपवित्रविश्वासे नियीयमानाः पवित्रेणात्मना
 प्रार्थनां कुर्वन्त 21 ईश्वरस्य प्रेम्ना स्वान् रक्षत, अनन्तज्ज्वनाय यास्माकं
 प्रभो र्यीशुप्रीष्टस्य कृपां प्रतीक्षध्वं। (aiōnios g166) 22 अपरं यूयं विविच्य
 कांश्चिद् अनुकम्पध्वं 23 कांश्चिद् अग्नित उद्धृत्य भयं प्रदृश्य रक्षत,
 शारीरिकभावेन कलङ्कितं वस्त्रमपि ऋतीयध्वं। 24 अपरञ्च युष्मान्
 स्मलनाद् रक्षितुम् उल्लासेन स्वीयतेजसः साक्षात् निर्दोषान् स्थापयितुञ्च
 समर्थो 25 यो ऽस्माकम् अद्वितीयस्त्राणकर्ता सर्वज्ञ ईश्वरस्तस्य गौरवं
 भविष्यति पराक्रमः कर्तृत्वञ्चेदानीम् अनन्तकालं यावद् भूयात्। आमेन्। (aiōn
 g165)

प्रकाशितं

1 यत् प्रकाशितं वाक्यम् एश्वरः स्वदासानां निकटं शीघ्रमुपस्थास्यन्तीनां घटनानां दर्शनार्थं यीशुप्रीष्टे समर्पितवान् तत् स स्वीयदूतं प्रेष्य निजसेवकं योडनं ज्ञापितवान् | 2 स येश्वरस्य वाक्ये प्रीष्टस्य साक्ष्ये य यद् दृष्टवान् तस्य प्रमाणं दत्तवान् | 3 अतस्य भविष्यद्वक्तृग्रन्थस्य वाक्यानां पाठकः श्रोतारश्च तन्मध्ये लिप्पिताज्ञाग्राहिएश्च धन्या यतः स कालः सन्निकटः | 4 योडन् आशियादेशस्थाः सप्त समितीः प्रति पत्रं लिप्पति | यो वर्तमानो भूतो भविष्यंश्च ये य सप्तात्मानस्तस्य सिंहासनस्य सम्भुभे तिष्ठन्ति 5 यश्च यीशुप्रीष्टो विश्वस्तः साक्षी मृतानां मध्ये प्रथमजातो भूमाऽलस्थराजानाम् अधिपतिश्च भवति, अतेभ्यो ऽनुग्रहः शान्तिश्च युष्मासु वर्ततां | 6 यो ऽस्मासु प्रीतवान् स्वरुधिरेणास्मान् स्वपापेभ्यः प्रक्षालितवान् तस्य पितुरीश्वरस्य याजकान् कृत्वास्मान् राजवर्गे नियुक्तवांश्च तस्मिन् भडिमा पराक्रमश्चानन्तकालं यावद् वर्ततां | आमेन् | (aiōn g165) 7 पश्यत स भेधैरागच्छति तेनैकैकस्य यक्षुस्तं द्रक्ष्यति ये य तं विद्ववन्तस्ते ऽपि तं विलोकिष्यन्ते तस्य कृते पृथिवीस्थाः सर्व्वे वंशा विलिपिष्यन्ति | सत्यम् आमेन् | 8 वर्तमानो भूतो भविष्यंश्च यः सर्व्वशक्तिमान् प्रभुः परमेश्वरः स गदति, अडभेव कः क्षश्चार्थत आदिरन्तश्च | 9 युष्माकं ब्राता यीशुप्रीष्टस्य क्लेशराज्यतितिक्षाणां सडभागी याडं योडन् एश्वरस्य वाक्यडेतो र्यीशुप्रीष्टस्य साक्ष्यडेतोश्च पात्मनामक उपद्वीप आसं | 10 तत्र प्रभो र्दिने आत्मनाविष्टो ऽडं स्वपश्चात् तूरीध्वनिवत् मडारवम् अश्रौषं, 11 तेनोक्तम्, अडं कः क्षश्चार्थत आदिरन्तश्च | त्वं यद् द्रक्ष्यसि तद् ग्रन्थे लिप्पित्वाशियादेशस्थानां सप्त समितीनां समीपम् एडिषं स्मुर्णां थुयातीरां सार्दिं डिलाडिड्कियां लायडीडेयाञ्च प्रेषय | 12 ततो मया सम्भाषमाणस्य कस्य रवः श्रूयते तद्दर्शनार्थं मुषं परावर्तितं तत् परावर्त्य स्वर्णमयाः सप्त दीपवृक्षा दृष्टाः | 13 तेषां सप्त दीपवृक्षाणां मध्ये दीर्घपरिच्छेदपरिहितः सुवर्णशूड्भलेन वेष्टितवक्षश्च मनुष्यपुत्राकृतिरेको जनस्तिष्ठति, 14 तस्य शिरः केशश्च श्वेतमेषलोमानीव डिमवत् श्रेतौ लोयने वह्निशिभासभे 15 यरणौ वह्निकुण्डेतापितसुपित्तलसदृशौ रवश्च बडुतोयानां रवतुल्यः | 16 तस्य दक्षिणडस्ते सप्त तारा विधन्ते वक्राण्य तीक्ष्णो द्विधारः षड्जो

निर्गच्छति मुष्माम्पुल्लञ्च स्वतेजसा देदीप्यमानस्य सूर्यस्य सदृशं | 17
 तं दृष्ट्वाहं मृतकल्पस्तय्यरणो पतितस्ततः स्वदक्षिणकरं भयि निधाय
 तेनोक्तम् मा भैषीः; अहम् आदिरन्तश्च | 18 अहम् अमरस्तथापि
 मृतवान् किन्तु पश्याहम् अनन्तकालं यावत् श्रुवामि | आमेन् | मृत्योः
 परलोकस्य य कुञ्जिका मम हस्तगताः | (aiōn g165, Hadēs g86) 19 अतो
 यद् भवति यय्येतः परं भविष्यति त्वया दृष्टं तत् सर्वं लिप्यतां | 20 मम
 दक्षिणहस्ते स्थिता याः सप्त तारा ये य स्वर्णमयाः सप्त दीपवृक्षास्त्वया
 दृष्टास्तत्तात्पर्यमिदं ताः सप्त ताराः सप्त समितीनां दूताः सुवर्णमयाः सप्त
 दीपवृक्षाश्च सप्त समितयः सन्ति |

2 षड्दिग्स्थसमिते दूतं प्रति त्वम् षट् लिप्य; यो दक्षिणकरेण सप्त तारा
 धारयति सप्तानां सुवर्णदीपवृक्षाणां मध्ये गमनागमने करोति य तेनेदम्
 उच्यते | 2 तव क्रियाः श्रमः सङ्घिष्णुता य मम गोचराः, त्वं दृष्टान् सोढुं न
 शक्नोषि ये य प्रेरिता न सन्तः स्वान् प्रेरितान् वदन्ति त्वं तान् परीक्ष्य
 भृषाभाषिणो विज्ञातवान्, 3 अपरं त्वं तितिक्षां विदधासि मम नामार्थं
 भङ्गु सोढवानसि तथापि न पर्यङ्कलाभ्यस्तदपि जानामि | 4 किञ्च तव
 विरुद्धं भवैतत् वक्तव्यं यत् तव प्रथमं प्रेम त्वया व्यधीयत | 5 अतः
 कुतः पतितो ऽसि तत् स्मृत्वा मनः परावर्त्य पूर्वोक्तक्रियाः कुरु न येत्
 त्वया मनसि न परिवर्तिते ऽहं तूर्णम् आगत्य तव दीपवृक्षं स्वस्थानाद्
 अपसारयिष्यामि | 6 तथापि तवेषु गुणो विधते यत् नीकलायतीयलोकानां
 याः क्रिया अहम् ऋतीये तास्त्वमपि ऋतीयमे | 7 यस्य श्रोत्रं विधते
 स समितीः प्रत्युच्यमानाम् आत्मनः कथां शृणोतु | यो जनो जयति
 तस्मा अहम् षड्वरस्यारामस्थश्रुवनतरोः इलं लोक्तुं दास्यामि | 8
 अपरं स्मृत्वास्थसमिते दूतं प्रतीदं लिप्य; य आदिरन्तश्च यो मृतवान्
 पुनर्जिवितवांश्च तेनेदम् उच्यते, 9 तव क्रियाः क्लेशो दैन्यञ्च मम गोचराः
 किन्तु त्वं धनवानसि ये य यिडूदीया न सन्तः शयतानस्य समाजाः सन्ति
 तथापि स्वान् यिडूदीयान् वदन्ति तेषां निन्दाभयं जानामि | 10 त्वया यो
 यः क्लेशः सोढव्यस्तस्मात् मा भैषीः पश्य शयतानो युष्माकं परीक्षार्थं
 कांश्चित् कारायां निक्षेप्यति दश दिनानि यावत् क्लेशो युष्मासु वर्तिष्यते
 य | त्वं मृत्युपर्यन्तं विश्वास्यो भव तेनाहं श्रुवनकिरीटं तुभ्यं दास्यामि |

11 यस्य श्रोत्रं विधते स समितीः प्रत्युच्यमानाम् आत्मनः कथां शृणोतु। यो जयति स द्वितीयमृत्युना न हिसिष्यते। 12 अपरं पर्गामिस्थसमिते दूतं प्रतीदं लिभ, यस्तीक्ष्णं द्विधारं षड् धारयति स अवे भाषते। 13 तव क्रिया मम गोयराः, यत्र शयतानस्य सिंहासनं तत्रैव त्वं वससि तदपि जानामि। त्वं मम नाम धारयसि मद्भक्तोरस्वीकारस्त्वया न कृतो मम विश्वास्यसाक्षिण आन्तिपाः समये ऽपि न कृतः। स तु युष्मन्मध्ये ऽधानि यतः शयतानस्तत्रैव निवसति। 14 तथापि तव विरुद्धं मम किञ्चिद् वक्तव्यं यतो देवप्रसादादनाय परदारगमनाय येसाथेलः सन्तानानां सम्भुष उन्माथं स्थापयितुं बालाङ् येनाशिक्ष्यत तस्य बिलियमः शिक्षावलम्बिनस्तव केचित् जनास्तत्र सन्ति। 15 तथा नीकलायतीयानां शिक्षावलम्बिनस्तव केचित् जना अपि सन्ति तदेवाहम् ऋतीये। 16 अतो हेतोस्त्वं मनः परिवर्तय न येदहं त्वरया तव समीपमुपस्थाय मद्भक्तस्थभङ्गेन तैः सह योत्स्यामि। 17 यस्य श्रोत्रं विधते स समितीः प्रत्युच्यमानाम् आत्मनः कथां शृणोतु। यो जनो जयति तस्मा अहं गुप्तमान्नां भोक्तुं दास्यामि शुभ्रप्रस्तरमपि तस्मै दास्यामि तत्र प्रस्तरे नूतनं नाम लिभितं तस्य ग्रहीतारं विना नान्येन केनाप्यवगम्यते। 18 अपरं थुयातीरास्थसमिते दूतं प्रतीदं लिभ। यस्य लोचने वह्निशिभासदृशे यरणौ य सुपित्तलसङ्घाशौ स षश्वरपुत्रो भाषते, 19 तव क्रियाः प्रेम विश्वासः परियथ्या सङ्घिषुता य मम गोयराः, तव प्रथमक्रियाभ्यः शेषक्रियाः श्रेष्ठास्तदपि जानामि। 20 तथापि तव विरुद्धं मया किञ्चिद् वक्तव्यं यतो या षषेबलनामिका योषित् स्वां भविष्यद्वादिनीं मन्यते वेश्यागमनाय देवप्रसादाशनाय य मम दासान् शिक्षयति ब्राभयति य सा त्वया न निवार्यते। 21 अहं मनःपरिवर्तनाय तस्यै समयं दत्तवान् किन्तु सा स्वीयवेश्याक्रियातो मनःपरिवर्तयितुं नाभिलषति। 22 पश्याहं तां शय्यायां निक्षेप्स्यामि, ये तथा साद्धं व्यभियारं कुर्वन्ति ते यदि स्वक्रियाभ्यो मनांसि न परावर्तयन्ति तर्हि तानपि मडाकलेशे निक्षेप्स्यामि 23 तस्याः सन्तानांश्च मृत्युना हनिष्यामि। तेनाहम् अन्तःकरणानां मनसाञ्चानुसन्धानकारी युष्माकमेकैकस्मै य स्वक्रियाणां क्लं मया दातव्यमिति सव्याः समितयो ज्ञास्यन्ति। 24 अपरम् अवशिष्टान् थुयातीरस्थलोकान् अर्थतो यावन्तस्तां शिक्षां न धारयन्ति ये य कैश्चित् शयतानस्य गमभीरार्था उच्यन्ते तान् ये

नावगतवन्तस्तानहं वदामि युष्मासु कमध्यपरं ભારં નારોપયિષ્યામિ; 25
 કિન્તુ યદ્ યુષ્માકં વિદ્યેતે તત્ મમાગમનં યાવદ્ ધારયત| 26 યો જનો
 જયતિ શેષપર્યન્તં મમ ક્રિયા: પાલયતિ ચ તસ્મા અહમ્ અન્યજાતીયાનામ્
 આધિપત્યં દાસ્યામિ; 27 પિતૃતો મયા યદ્વત્ કર્તૃત્વં લબ્ધં તદ્વત્ સો ડપિ
 લૌહદણ્ડેન તાન્ ચારયિષ્યતિ તેન મૂઢ્ઢાજનાનીવ તે ચૂર્ણા ભવિષ્યન્તિ| 28
 અપરમ્ અહં તસ્મૈ પ્રભાતીયતારામ્ અપિ દાસ્યામિ| 29 યસ્ય શ્રોત્રં વિદ્યેતે
 સ સમિતી: પ્રત્યુચ્યમાનામ્ આત્મન: કથાં શૃણોતુ|

3 અપરં સાર્દિસ્થસમિતે દૂતં પ્રતીદં લિખ, યો જન ઈશ્વરસ્ય સપ્તાત્મન:
 સપ્ત તારાશ્ચ ધારયતિ સ એવ ભાષતે, તવ ક્રિયા મમ ગોચરા:, ત્વં
 જીવદાખ્યો ડસિ તથાપિ મૃતો ડસિ તદપિ જાનામિ| 2 પ્રબુદ્ધો ભવ, અવશિષ્ટં
 યદ્યત્ મૃતકલ્પં તદપિ સબલીકુરુ યત ઈશ્વરસ્ય સાક્ષાત્ તવ કર્મ્માણિ
 ન સિદ્ધાનીતિ પ્રમાણં મયા પ્રાપ્તં| 3 અત: કીદૃશીં શિક્ષાં લબ્ધવાન્
 શ્રુતવાશ્ચાસિ તત્ સ્મરન્ તાં પાલય સ્વમન: પરિવર્તય ચ| યેત્ પ્રબુદ્ધો ન
 ભવેસ્તર્હ્યાહં સ્તેન ઈવ તવ સમીપમ્ ઉપસ્થાસ્યામિ કિન્તુ કસ્મિન્ દણ્ડે
 ઉપસ્થાસ્યામિ તન્ન જ્ઞાસ્યસિ| 4 તથાપિ યૈ: સ્વવાસાંસિ ન કલક્રિતાનિ
 તાદૃશા: કતિપયલોકા: સાર્દિનગરે ડપિ તવ વિદ્યન્તે તે શુભપરિચ્છદૈ મમ સજ્ઞે
 ગમનાગમને કરિષ્યન્તિ યતસ્તે યોગ્યા:| 5 યો જનો જયતિ સ શુભપરિચ્છદં
 પરિધાપયિષ્યન્તે, અહઞ્ જીવનગ્રન્થાત્ તસ્ય નામ નાન્તર્ધાપયિષ્યામિ કિન્તુ
 મત્પિતુ: સાક્ષાત્ તસ્ય દૂતાનાં સાક્ષાચ્ચ તસ્ય નામ સ્વીકરિષ્યામિ| 6 યસ્ય
 શ્રોત્રં વિદ્યેતે સ સમિતી: પ્રત્યુચ્યમાનામ્ આત્મન: કથાં શૃણોતુ| 7 અપરઞ્
 ક્ષિલાદિક્લિયાસ્થસમિતે દૂતં પ્રતીદં લિખ, ય: પવિત્ર: સત્યમયશ્ચાસ્તિ દાયુદ:
 કુચ્ચિકાં ધારયતિ ચ યેન મોચિતે ડપર: કોડપિ ન રુણદ્ધિ રુદ્ધે ચાપર: કોડપિ
 ન મોચયતિ સ એવ ભાષતે| 8 તવ ક્રિયા મમ ગોચરા: પશ્ય તવ સમીપે ડહં
 મુક્તં દ્વારં સ્થાપિતવાન્ તત્ કેનાપિ રોદ્ધું ન શક્યતે યતસ્તવાલ્પં બલમાસ્તે
 તથાપિ ત્વં મમ વાક્યં પાલિતવાન્ મમ નામ્નો ડસ્વીકારં ન કૃતવાંશ્ચ| 9
 પશ્ય યિહૂદીયા ન સન્તો યે મૃષાવાદિન: સ્વાન્ યિહૂદીયાન્ વદન્તિ તેષાં
 શયતાનસમાજીયાનાં કાંશ્ચિદ્ અહમ્ આનેષ્યામિ પશ્ય તે મદાજ્ઞાત આગત્ય
 તવ ચરણયો: પ્રણંસ્યન્તિ ત્વઞ્ મમ પ્રિયો ડસીતિ જ્ઞાસ્યન્તિ| 10 ત્વં
 મમ સહિષ્ણુતાસૂચકં વાક્યં રક્ષિતવાનસિ તત્કારણાત્ પૃથિવીનિવાસિનાં

તત્ર સિંહાસને એકો જન ઉપવિષ્ણો ડસ્તિ | 3 સિંહાસને ઉપવિષ્ણસ્ય
 તસ્ય જનસ્ય રૂપં સૂર્યકાન્તમણોઃ પ્રવાલસ્ય ચ તુલ્યં તત્ સિંહાસનઞ્ચ
 મરકતમણિવદ્રૂપવિશિષ્ટેન મેઘધનુષા વેષ્ટિતં | 4 તસ્ય સિંહાસને ચતુર્દિક્ષુ
 ચતુર્વિંશતિસિંહાસનાનિ તિષ્ઠન્તિ તેષુ સિંહાસનેષુ ચતુર્વિંશતિ પ્રાચીનલોકા
 ઉપવિષ્ણસ્તે શુભ્રવાસઃપરિહિતાસ્તેષાં શિરાંસિ ચ સુવર્ણકિરીટૈ ભૂષિતાનિ |
 5 તસ્ય સિંહાસનસ્ય મધ્યાત્ તડિતો રવાઃ સ્તનિતાનિ ચ નિર્ગચ્છન્તિ
 સિંહાસનસ્યાન્તિકે ચ સપ્ત દીપા જ્વલન્તિ ત ઈશ્વરસ્ય સપ્તાત્માનઃ |
 6 અપરં સિંહાસનસ્યાન્તિકે સ્ફટિકતુલ્યઃ કાયમયો જલાશયો વિધતે,
 અપરમ્ અગ્રતઃ પશ્ચાચ્ય બહુચક્ષુષ્મન્તશ્રત્વારઃ પ્રાણિનઃ સિંહાસનસ્ય
 મધ્યે ચતુર્દિક્ષુ ચ વિધન્તે | 7 તેષાં પ્રથમઃ પ્રાણી સિંહાકારો દ્વિતીયઃ
 પ્રાણી ગોવાત્સાકારસ્તૃતીયઃ પ્રાણી મનુષ્યવદ્દનવિશિષ્ટશ્રતુર્થશ્ર પ્રાણી
 ઉડ્ડીયમાનકુરોપમઃ | 8 તેષાં ચતુર્ણામ્ એકૈકસ્ય પ્રાણિનઃ ષટ્ પક્ષાઃ
 સન્તિ તે ચ સર્વાઙ્ગેષ્વભ્યન્તરે ચ બહુચક્ષુર્વિશિષ્ટાઃ, તે દિવાનિશં ન
 વિશ્રામ્ય ગદન્તિ પવિત્રઃ પવિત્રઃ પવિત્રઃ સર્વશક્તિમાન્ વર્તમાનો ભૂતો
 ભવિષ્યંશ્ર પ્રભુઃ પરમેશ્વરઃ | 9 ઇત્યં તૈઃ પ્રાણિભિસ્તસ્યાનન્તજીવિનઃ
 સિંહાસનોપવિષ્ણસ્ય જનસ્ય પ્રભાવે ગૌરવે ધન્યવાદે ચ પ્રકીર્તિતે (aiōn
 g165) 10 તે ચતુર્વિંશતિપ્રાચીના અપિ તસ્ય સિંહાસનોપવિષ્ણસ્યાન્તિકે
 પ્રણિનત્ય તમ્ અનન્તજીવિનં પ્રણમન્તિ સ્વીચકિરીટાંશ્ર સિંહાસનસ્યાન્તિકે
 નિક્ષિપ્ય વદન્તિ, (aiōn g165) 11 હે પ્રભો ઈશ્વરાસ્માકં પ્રભાવં ગૌરવં બલં |
 ત્વમેવાર્હસિ સમ્પ્રાપ્તું ચત્ સર્વ્યં સસૃજે ત્વયા | તવાભિલાષતશ્રૈવ સર્વ્યં
 સમ્ભૂય નિર્મમે | |

5 અનન્તરં તસ્ય સિંહાસનોપવિષ્ણજનસ્ય દક્ષિણસ્તે ડન્ત ઈહિશ્ર લિખિતં
 પત્રમેકં મયા દૃષ્ટં તત્ સપ્તમુદ્રાભિરઙ્કિતં | 2 તત્પશ્ચાદ્ એકો બલવાન્
 દૂતો દૃષ્ટઃ સ ઉચ્ચૈઃ સ્વરેણ વાયમિમાં ઘોષયતિ કઃ પત્રમેતદ્ વિવરીતું
 તમ્મુદ્રા મોચયિતુઞ્ચાર્હતિ? 3 કિન્તુ સ્વર્ગમર્ત્યપાતાલેષુ તત્ પત્રં વિવરીતું
 નિરીક્ષિતુઞ્ચ કસ્યાપિ સામર્થ્યં નાભવત્ | 4 અતો યસ્તત્ પત્રં વિવરીતું
 નિરીક્ષિતુઞ્ચાર્હતિ તાદૃશજનસ્યાભાવાદ્ અહં બહુ રોદિતવાન્ | 5 કિન્તુ
 તેષાં પ્રાચીનાનામ્ એકો જનો મામવદત્ મા રોદીઃ પશ્ય યો ચિહ્નુદાવંશીયઃ
 સિંહો દાયૂદો મૂલસ્વરૂપશ્રાસ્તિ સ પત્રસ્ય તસ્ય સપ્તમુદ્રાણાઞ્ચ મોચનાય

પ્રમૂતવાનું | 6 અપરં સિંહાસનસ્ય ચતુર્ણાં પ્રાણિનાં પ્રાચીનવર્ગસ્ય ચ મધ્ય એકો મેષશાવકો મયા દૃષ્ટઃ સ છેદિત ઇવ તસ્ય સપ્તશૃંગાણિ સપ્તલોચનાનિ ચ સન્તિ તાનિ કૃત્સ્નાં પૃથિવી પ્રેષિતા ઈશ્વરસ્ય સપ્તાત્માનઃ | 7 સ ઉપાગત્ય તસ્ય સિંહાસનોપવિષ્ઠજનસ્ય દક્ષિણકરાત્ તત્ પત્રં ગૃહીતવાનું | 8 પત્રે ગૃહીતે ચત્વારઃ પ્રાણિનશ્ચતુર્વિંશતિપ્રાચીનાશ્ચ તસ્ય મેષશાવકસ્યાન્તિકે પ્રણિપતન્તિ તેષામ્ એકૈકસ્ય કરયો વીંણાં સુગન્ધિદ્રવ્યૈઃ પરિપૂર્ણાં સ્વાર્ણમયપાત્રાં તિષ્ઠતિ તાનિ પવિત્રલોકાનાં પ્રાર્થનાસ્વરૂપાણિ | 9 અપરં તે નૂતનમેકં ગીતમગાયન્, યથા, ગ્રહીતું પત્રિકાં તસ્ય મુદ્રા મોચયિતું તથા | ત્વમેવાર્હસિ યસ્માત્ ત્વં બલિવત્ છેદનં ગતઃ | સર્વાભ્યો જાતિભાષાભ્યઃ સર્વસ્માદ્ વંશદેશતઃ | ઈશ્વરસ્ય કૃતે ડસ્માન્ ત્વં સ્વીયરક્તેન ક્રીતવાનું | 10 અસ્મદીશ્વરપક્ષે ડસ્માન્ નૃપતીન્ યાજકાનપિ | કૃતવાંસ્તેન રાજત્વં કરિષ્યામો મહીતલે | | 11 અપરં નિરીક્ષમાણેન મયા સિંહાસનસ્ય પ્રાણિયતુષ્ઠયસ્ય પ્રાચીનવર્ગસ્ય ચ પરિતો બહૂનાં દૂતાનાં રવઃ શ્રુતઃ, તેષાં સંખ્યા અયુતાયુતાનિ સહસ્રસહસ્રાણિ ચ | 12 તૈરુચ્ચૈરિદમ્ ઉક્તં, પરાક્રમં ધનં જ્ઞાનં શક્તિં ગૌરવમાદરં | પ્રશંસાઞ્ચાર્હતિ પ્રાપ્તું છેદિતો મેષશાવકઃ | | 13 અપરં સ્વર્ગમર્ત્યપાતાલસાગરેષુ યાનિ વિધન્તે તેષાં સર્વેષાં સૃષ્ટવસ્તૂનાં વાગિયં મયા શ્રુતા, પ્રશંસાં ગૌરવં શૌર્યમ્ આધિપત્યં સનાતનં | સિંહસનોપવિષ્ઠશ્ચ મેષવત્સશ્ચ ગચ્છતાં | (aiōn g165) 14 અપરં તે ચત્વારઃ પ્રાણિનઃ કથિતવન્તસ્તથાસ્તુ, તતશ્ચતુર્વિંશતિપ્રાચીના અપિ પ્રણિપત્ય તમ્ અનન્તકાલજીવિનં પ્રાણમનું |

6 અનન્તરં મયિ નિરીક્ષમાણે મેષશાવકેન તાસાં સપ્તમુદ્રાણામ્ એકા મુદ્રા મુક્તા તતસ્તેષાં ચતુર્ણામ્ એકસ્ય પ્રાણિન આગત્ય પશ્યેતિવાચકો મેઘગર્જનતુલ્યો રવો મયા શ્રુતઃ | 2 તતઃ પરમ્ એકઃ શુકલાશ્ચો દૃષ્ટઃ, તદારૂઢો જનો ધનુ ધારયતિ તસ્મૈ ચ કિરીટમેકમ્ અદાયિ તતઃ સ પ્રભવન્ પ્રભવિષ્યંશ્ચ નિર્ગતવાનું | 3 અપરં દ્વિતીયમુદ્રાયાં તેન મોચિતાયાં દ્વિતીયસ્ય પ્રાણિન આગત્ય પશ્યેતિ વાક્ મયા શ્રુતા | 4 તતો ડરુણવર્ણો ડપર એકો ડશ્વો નિર્ગતવાનું તદારોહિણિ પૃથિવીતઃ શાન્ત્યપહરણસ્ય લોકાનાં મધ્યે પરસ્પરં પ્રતિઘાતોત્પાદનસ્ય ચ સામર્થ્યં સમર્પિતમ્, એકો બૃહત્ખજ્જો ડપિ તસ્મા અદાયિ | 5 અપરં તૃતીયમુદ્રાયાં તન મોચિતાયાં તૃતીયસ્ય પ્રાણિન આગત્ય

पश्येति वाक् मया श्रुता, ततः कालवर्षा अेको ऽश्वो मया दृष्टः, तदारोहिणो
 ङस्ते तुला तिष्ठति 6 अनन्तरं प्राणियतुष्टयस्य मध्याद् वागियं श्रुता
 गोधूमानामेकः सेटको मुद्रापादैकमूल्यः, यवानाञ्च सेटकत्रयं मुद्रापादैकमूल्यं
 तैलद्राक्षारसाश्च त्वया मा ङिसितव्याः। 7 अनन्तरं यतुर्थमुद्रायां तेन
 भोयितायां यतुर्थस्य प्राणिन आगत्य पश्येति वाक् मया श्रुता। 8 ततः
 पाण्डुरवर्षा अेको ऽश्वो मया दृष्टः, तदारोहिणो नाम मृत्युरिति परलोकश्च
 तम् अनुचरति ञ्जेन दृढिक्षेण मडामार्या वन्यपशुमिश्च लोकानां बधाय
 पृथिव्याश्चतुर्थाशस्याधिपत्यं तस्मा अदायि। (Madēs 986) 9 अनन्तरं
 पञ्चममुद्रायां तेन भोयितायाम् षश्वरवाक्यहेतोस्तत्र साक्ष्यदानाय
 छेदितानां लोकानां देहिना वेधा अधो मयादृश्यन्त। 10 त उच्यैरिदं गदन्ति,
 हे पवित्र सत्यमय प्रभो अस्माकं रक्तपाते पृथिवीनिवासिभि विवदितुं
 तस्य इल दातुञ्च कति कालं विलम्बसे? 11 ततस्तेषाम् अेकैकस्मै शुभ्रः
 परिच्छदो ऽदायि वागियञ्चाकथ्यत यूयमल्पकालम् अर्थतो युष्माकं ये
 सडादासा त्रातरो यूयमिव धानिष्यन्ते तेषां संप्या यावत् सम्पूर्णांतां न
 गच्छति तावद् विरमत। 12 अनन्तरं यदा स षष्ठमुद्रामभोययत् तदा
 मयि निरीक्षमाणो मडान् भूकम्पो ऽभवत् सूर्यश्च उष्ट्रलोमजवस्त्रवत्
 कृष्णवर्षाश्चन्द्रमाश्च रक्तसङ्काशो ऽभवत् 13 गगनस्थताराश्च प्रबलवायुना
 यालिताद् उडुम्बरवृक्षात् निपातितान्यपक्कङ्कलानीव भूतले न्यपतन्। 14
 आकाशमण्डलञ्च सङ्कुच्यमानग्रन्थध्वान्तर्धानम् अगमत् गिरय उपद्वीपाश्च
 सर्वे स्थानान्तरं यालिताः 15 पृथिवीस्था भूपाला मडाल्लोकाः सडस्त्रपतयो
 धनिनः पराङ्मिणश्च लोका दासा मुक्ताश्च सर्वे ऽपि गुडासु गिरिस्थशैलेषु
 य स्वान् प्राच्छाद्यन्। 16 ते य गिरीन् शैलांश्च वदन्ति यूयम् अस्मदुपरि
 पतित्वा सिंहासनोपविष्टजनस्य दृष्टितो मेषशावकस्य कोपाय्यास्मान्
 गोपायत; 17 यतस्तस्य क्रोधस्य मडान्निभम् उपस्थितं कः स्थातुं शक्नोति?

7 अनन्तरं यत्वारो दिव्यदूता मया दृष्टाः, ते पृथिव्याश्चतुर्षु कोणेषु तिष्ठन्तः
 पृथिव्यां समुद्रे वृक्षेषु य वायु र्यथा न वडेत् तथा पृथिव्याश्चतुरो वायून्
 धारयन्ति। 2 अनन्तरं सूर्योदयस्थानाद् उधन् अपर अेको दूतो मया
 दृष्टः सोऽमरेश्वरस्य मुद्रां धारयति, येषु यतुषु दूतेषु पृथिवीसमुद्रयो
 ङिसनस्य त्मारो दत्तस्तान् स उच्यैरिदं अवदत्। 3 षश्वरस्य दासा

यावद् अस्माभिर्भाषेषु मुद्रयाङ्किता न भविष्यन्ति तावत् पृथिवी समुद्रो
 तरवश्च युष्माभिर्न हिंस्यन्तां। 4 ततः परं मुद्राङ्कितलोकानां संप्रिया
 मयाश्रावि। षष्ठायेतः सर्व्ववंशायाश्चतुश्चत्वारिंशत्सहस्राधिकलक्षलोका
 मुद्रयाङ्किता अभवन्, 5 अर्थतो यिद्धावंशे द्वादशसहस्राणि त्रयोदशवंशे
 द्वादशसहस्राणि गण्डवंशे द्वादशसहस्राणि, 6 आशेरवंशे द्वादशसहस्राणि
 नन्तालिवंशे द्वादशसहस्राणि भिनशिवंशे द्वादशसहस्राणि, 7 शिमियोनवंशे
 द्वादशसहस्राणि लेविवंशे द्वादशसहस्राणि षष्ठापरवंशे द्वादशसहस्राणि,
 8 सिबूलूनवंशे द्वादशसहस्राणि यूषड्वंशे द्वादशसहस्राणि बिन्यामीनवंशे
 य द्वादशसहस्राणि लोका मुद्राङ्किताः। 9 ततः परं सर्व्वजातीयानां
 सर्व्ववंशीयानां सर्व्वदेशीयानां सर्व्वभाषावादिनाञ्च महालोकारण्यं मया
 दृष्टं, तान् गणयितुं केनापि न शक्यं, ते य शुभ्रपरिच्छेदपरिहिताः
 सन्तः करैश्च तालवृन्तानि वदन्तः सिंहासनस्य मेषशावकस्य यान्तिके
 तिष्ठन्ति, 10 उच्यैःस्वरैरिदं कथयन्ति य, सिंहासनोपविष्टस्य परमेशस्य
 नः स्तवः। स्तवश्च मेषवत्सस्य सम्भूयात् त्राणकारणात्। 11 ततः
 सर्व्वे दूताः सिंहासनस्य प्राचीनवर्गस्य प्राणितुष्टयस्य य परितस्तिष्ठन्तः
 सिंहासनस्यान्तिके न्यूञ्जुभूयेश्वरं प्राणय वदन्ति, 12 तथास्तु धन्यवाद्दश्च
 तेजो ज्ञानं प्रशंसन्। शौर्य्यं पराक्रमश्चापि शक्तिश्च सर्व्वमेव तत्।
 वर्त्ततामीश्वरेऽस्माकं नित्यं नित्यं तथास्त्विति। (a10n g165) 13 ततः परं
 तेषां प्राचीनानाम् अको जनो मां सम्भाष्य जगाद् शुभ्रपरिच्छेदपरिहिता
 एमे के? कुतो वागताः? 14 ततो मयोक्तं हे महेच्छ भवानेव तत्
 जानाति। तेन कथितं, एमे महाकलेशमध्याद् आगत्य मेषशावकस्य रुधिरेश
 स्वीयपरिच्छेदान् प्रक्षालितवन्तः शुक्लीकृतवन्तश्च। 15 तत्कारणात् त
 एश्वरस्य सिंहासनस्यान्तिके तिष्ठन्तो द्विवारात्रं तस्य मन्दिरे तं सेवन्ते
 सिंहासनोपविष्टो जनश्च तान् अधिस्थास्यति। 16 तेषां क्षुधा पिपासा
 वा पुनर्न भविष्यति शैद्रं कोप्युत्तापो वा तेषु न निपतिष्यति, 17
 यतः सिंहासनाधिष्ठानकारी मेषशावकस्तान् यारयिष्यति, अमृततोयानां
 प्रसवणानां सन्निधिं तान् गमयिष्यति य, एश्वरोऽपि तेषां नयनभ्यः
 सर्व्वमश्रु प्रमाक्ष्यति।

8 अनन्तरं सप्तममुद्रायां तेन मोयितायां सार्द्धदण्डकालं स्वर्गो निःशब्दोऽभवत् | 2 अपरम् अहम् ईश्वरस्यान्तिके तिष्ठतः सप्तदूतान् अपश्यं तेभ्यः सप्ततूर्याऽऽदीयन्त | 3 ततः परम् अन्ये अको दूत आगतः स स्वर्णधूपाधारं गृहीत्वा वेदिमुपातिष्ठत् स य यत् सिंहासनस्यान्तिके स्थितायाः सुवर्णवेधा उपरि सर्वेषां पवित्रलोकानां प्रार्थनासु धूपान् योजयेत् तदर्थं प्रयुरधूपास्तस्मै दत्ताः | 4 ततस्तस्य दूतस्य करात् पवित्रलोकानां प्रार्थनाभिः संयुक्तधूपानां धूम ईश्वरस्य समक्षं उदतिष्ठत् | 5 पश्चात् स दूतो धूपाधारं गृहीत्वा वेधा वह्निना पूरयित्वा पृथिव्यां निक्षिप्तवान् तेन रवा भेद्यगर्ज्जनानि विधुतो भूमिकम्पश्चात्भवन् | 6 ततः परं सप्ततूरी धारयन्तः सप्तदूतास्तूरी वार्धयितुम् उद्यता अभवन् | 7 प्रथमेन तूर्या वादितायां रक्तमिश्रितौ शिलावह्नी सम्भूय पृथिव्यां निक्षिप्तौ तेन पृथिव्यास्तृतीयांशो दग्धः, तदृणामपि तृतीयांशो दग्धः, हरिद्वर्णतृणानि य सर्वाणि दग्धानि | 8 अनन्तरं द्वितीयदूतेन तूर्या वादितायां वह्निना प्रज्वलितो महापर्वतः सागरे निक्षिप्तस्तेन सागरस्य तृतीयांशो रक्तीभूतः 9 सागरे स्थितानां सप्राणानां सृष्टवस्तूनां तृतीयांशो मृतः, आर्णवयानानाम् अपि तृतीयांशो नष्टः | 10 अपरं तृतीयदूतेन तूर्या वादितायां दीप एव ज्वलन्ती अका मलती तारा गगणात् निपत्य नदीनां जलप्रस्रवणानाञ्चोपर्यावतीर्णा | 11 तस्यास्ताराया नाम नागदमनकमिति, तेन तोयानां तृतीयांशे नागदमनकीभूते तोयानां तिक्तत्वात् अबवो मानवा मृताः | 12 अपरं यतुर्थदूतेन तूर्या वादितायां सूर्यस्य तृतीयांशश्चन्द्रस्य तृतीयांशो नक्षत्राणाञ्च तृतीयांशः प्रहतः, तेन तेषां तृतीयांशे ऽन्धकारीभूते दिवसस्तृतीयांशकालं यावत् तेजोहीनो भवति निशापि तामेवावस्थां गच्छति | 13 तदा निरीक्षमाणेन मयाकाशमध्येनाभिपतत अकस्य दूतस्य रवः श्रुतः स उच्यै र्गदति, अपरै र्यैस्त्रिभि र्दूतैस्तूर्या वादितव्यास्तेषाम् अवशिष्टतूरीध्वनितः पृथिवीनिवासिनां सन्तापः सन्तापः सन्तापश्च सम्भविष्यति |

9 ततः परं सप्तमदूतेन तूर्या वादितायां गगनात् पृथिव्यां निपतित अकस्तारको मया दृष्टः, तस्मै रसातलकूपस्य कुञ्जिकाद्यायि | (Abyssos g12) 2 तेन रसातलकूपे मुक्ते महाग्निकुण्डस्य धूम एव धूमस्तस्मात्

કૂપાદ્ ઉદ્ગતઃ | તસ્માત્ કૂપધૂમાત્ સૂર્યાકાશૌ તિમિરાવૃતૌ | (Abyssos
 g12) 3 તસ્માદ્ ધૂમાત્ પતજ્ઞેષુ પૃથિવ્યાં નિર્ગતેષુ નરલોકસ્થવૃશ્ચિકવત્ બલં
 તેભ્યોડદાયિ | 4 અપરં પૃથિવ્યાસ્તૃણાનિ હરિદ્વર્ણશાકાદયો વૃક્ષાશ્ચ તૈ
 ન સિંહિતવ્યાઃ કિન્તુ યેષાં ભાલેષ્વીશ્વરસ્ય મુદ્રાયા અહ્નો નાસ્તિ કેવલં
 તે માનવાસ્તૈ હિંસિતવ્યા ઇદં ત આદિષ્ટાઃ | 5 પરન્તુ તેષાં બધાય નહિ
 કેવલં પઞ્ચ માસાન્ યાવત્ યાતનાદાનાય તેભ્યઃ સામર્થ્યમદાયિ | વૃશ્ચિકેન
 દષ્ટસ્ય માનવસ્ય યાદૃશી યાતના જાયતે તેરપિ તાદૃશી યાતના પ્રદીયતે |
 6 તસ્મિન્ સમયે માનવા મૃત્યું મૃગયિષ્યન્તે કિન્તુ પ્રાપ્તું ન શક્ચન્તિ, તે
 પ્રાણાન્ ત્યક્તુમ્ અભિલષિષ્યન્તિ કિન્તુ મૃત્યુસ્તેભ્યો દૂરં પલાયિષ્યતે | 7
 તેષાં પતજ્ઞાનામ્ આકારો યુદ્ધાર્થં સુસજ્જિજતાનામ્ અશ્વાનામ્ આકારસ્ય
 તુલ્યઃ, તેષાં શિરઃસુ સુવર્ણકિરીટાનીવ કિરીટાનિ વિધન્તે, મુખમાણ્ડલાનિ
 ચ માનુષિકમુખતુલ્યાનિ, 8 કેશાશ્ચ ચોષિતાં કેશાનાં સદૃશાઃ, દન્તાશ્ચ
 સિંહદન્તતુલ્યાઃ, 9 લૌહકવચવત્ તેષાં કવચાનિ સન્તિ, તેષાં પક્ષાણાં
 શબ્દો રણાય ધાવતામશ્વરથાનાં સમૂહસ્ય શબ્દતુલ્યઃ | 10 વૃશ્ચિકાનામિવ
 તેષાં લાજ્જૂલાનિ સન્તિ, તેષુ લાજ્જૂલેષુ કણ્ટકાનિ વિધન્તે, અપરં પઞ્ચ
 માસાન્ યાવત્ માનવાનાં હિંસનાય તે સામર્થ્યપ્રાપ્તાઃ | 11 તેષાં રાજા
 ય રસાતલસ્ય દૂતસ્તસ્ય નામ ઇબ્રીયભાષયા અબદ્દોન્ યૂનાનીયભાષયા
 ય અપલ્લુયોન્ અર્થતો વિનાશક ઇતિ | (Abyssos g12) 12 પ્રથમઃ
 સન્તાપો ગતવાન્ પશ્ય ઇતઃ પરમપિ દ્વાભ્યાં સન્તાપાભ્યામ્ ઉપસ્થાતવ્યં |
 13 તતઃ પરં ષષ્ટદૂતેન તૂર્યા વાદિતાયામ્ ઇશ્વરસ્યાન્તિકે સ્થિતાયાઃ
 સુવર્ણવેદાશ્ચતુશ્રૂડાતઃ કસ્યચિદ્ રવો મયાશ્રાવિ | 14 સ તૂરીધારિણં
 ષષ્ટદૂતમ્ અવદત્, ફરાતાખ્યે મહાનદે યે ચત્વારો દૂતા બદ્ધાઃ સન્તિ તાન્
 મોચય | 15 તતસ્તદ્વણ્ડસ્ય તદ્દિનસ્ય તન્માસસ્ય તદ્વત્સરસ્ય ચ કૃતે
 નિરૂપિતાસ્તે ચત્વારો દૂતા માનવાનાં તૃતીયાંશસ્ય બધાર્થં મોચિતાઃ | 16
 અપરમ્ અશ્વારોહિસૈન્યાનાં સંખ્યા મયાશ્રાવિ, તે વિંશતિકોટય આસન્ |
 17 મયા યે ડશ્વા અશ્વારોહિણાશ્ચ દૃષ્ટાસ્ત એતાદૃશાઃ, તેષાં વહ્નિસ્વરૂપાણિ
 નીલપ્રસ્તરસ્વરૂપાણિ ગન્ધકસ્વરૂપાણિ ચ વર્માણ્યાસન્, વાજિનાઞ્ચ
 સિંહમૂર્દ્ધસદૃશા મૂર્દ્ધાનઃ, તેષાં મુખેભ્યો વહ્નિધૂમગન્ધકા નિર્ગચ્છન્તિ |
 18 એતૈસ્ત્રિભિ ઈર્ણૈરર્થતસ્તેષાં મુખેભ્યો નિર્ગચ્છદ્ધિ વહ્નિધૂમગન્ધકૈ

मनुष्याणां तुतीयांशो ऽधानि। 19 तेषां वाञ्छिनां बलं मुष्पेषु लाङ्गूलेषु
य स्थितं, यतस्तेषां लाङ्गूलानि सर्पाकाराणि मस्तकविशिष्टानि य तैरेव
ते हिंसन्ति। 20 अपरम् अवशिष्टा ये मानवा तैर् दण्डैर् न हतास्ते यथा
दृष्टिश्रवणगमनशक्तिहीनान् स्वर्णरीप्यपित्तलप्रस्तरकाष्ठमयान् विग्रहान्
भूतांश्च न पूजयिष्यन्ति तथा स्वहस्तानां क्रियात्म्यः स्वमनांसि न
परावर्त्तितवन्तः 21 स्वबधकुडकव्यभियारथौर्योत्थो ऽपि मनांसि न
परावर्त्तितवन्तः।

10 अनन्तरं स्वर्गाद् अवरोहन् अपर ओको महाबलो दूतो मया दृष्टः, स
परिहितभेद्यस्तस्य शिरश्च भेद्यधनुषा भूषितं मुष्मण्डलञ्च सूर्य्यतुल्यं
यरणौ य वह्निस्तम्भसमौ। 2 स स्वक्रेण विस्तीर्णमेकं क्षुद्रग्रन्थं धारयति,
दक्षिणयरणेन समुद्रे वामयरणेन य स्थले तिष्ठति। 3 स सिंहागर्जनवद्
उच्यैःस्वरेण न्यनदत् निनादे कृते सप्त स्तनितानि स्वकीयान् स्वनान्
प्राकाशयन्। 4 तैः सप्त स्तनितैर् वाक्ये कथिते ऽहं तत् लेप्सितुम् उद्यत
आसं किन्तु स्वर्गाद् वागियं मया श्रुता सप्त स्तनितैर् यद् यद् उक्तं तत्
मुद्रयाङ्घ्रि मा लिप्। 5 अपरं समुद्रमेदिन्योस्तिष्ठन् यो दूतो मया दृष्टः स
गगनं प्रति स्वदक्षिणकरमुत्थाप्य 6 अपरं स्वर्गाद् यस्य रवो मयाश्रावि स
पुनर् मां सम्भाष्यावदत् त्वं गत्वा समुद्रमेदिन्योस्तिष्ठतो दूतस्य करात् तं
विस्तीर्णं क्षुद्रग्रन्थं गृह्णाण, तेन मया दूतसमीपं गत्वा कथितं ग्रन्थो ऽसौ
दीयतां। (aiōn g165) 7 किन्तु तूरीं वादिष्यतः सप्तमदूतस्य तूरीवादनसमय
एश्वरस्य गुप्ता मन्त्राणा तस्य दासान् भविष्यद्वादिनः प्रति तेन सुसंवादे
यथा प्रकाशिता तथैव सिद्धा भविष्यति। 8 अपरं स्वर्गाद् यस्य रवो
मयाश्रावि स पुनर् मां सम्भाष्यावदत् त्वं गत्वा समुद्रमेदिन्योस्तिष्ठतो दूतस्य
करात् तं विस्तीर्णं क्षुद्रग्रन्थं गृह्णाण, 9 तेन मया दूतसमीपं गत्वा कथितं
ग्रन्थो ऽसौ दीयतां। स माम् अवदत् तं गृहीत्वा गिल, तवोदरे स तिक्तस्वो
भविष्यति किन्तु मुष्पे मधुवत् स्वाद् भविष्यति। 10 तेन मया दूतस्य
कराद् ग्रन्थो गृहीतो गिलितश्च। स तु मम मुष्पे मधुवत् स्वादुरासीत्
किन्वदनात् परं भमोदरस्तिक्ततां गतः। 11 ततः स माम् अवदत् बहून्
जातिवंशभाषावदिराजान् अधि त्वया पुनर् भविष्यद्वाक्यं वक्तव्यं।

11 अनन्तरं परिमाणदण्डवद् अको नलो मह्यमदायि, स य दूत उपतिष्ठन्
 माम् अवदत्, उत्थायेश्वरस्य मन्दिरं वेदीं तत्रत्यसेवकांश्च भिभीष्य | 2 किन्तु
 मन्दिरस्य बहिःप्राङ्गणं त्यज न भिभीष्य यतस्तद् अन्यजातीयेभ्यो दत्तं,
 पवित्रं नगरञ्च द्वियत्वारिंशन्मासान् यावत् तेषां यरणौ र्मिर्दिष्यते | 3 पश्चात्
 मम द्वाभ्यां साक्षिभ्यां मया सामर्थ्यं दायिष्यते तावुष्ट्रलोमजवस्त्रपरिहितौ
 षष्ठ्यधिकद्विशताधिकसहस्रदिनानि यावद् भविष्यद्वाक्यानि वदिष्यतः |
 4 तावेव जगदीश्वरस्यान्तिके तिष्ठन्तौ जितवृक्षौ दीपवृक्षौ य | 5 यद्वि
 केयित् तौ हिंसितुं येष्टन्ते तर्हि तयो र्वदनाभ्याम् अग्निर्निर्गत्य तयोः शत्रून्
 भस्मीकरिष्यति | यः कश्चित् तौ हिंसितुं येष्टते तेनैवमेव विनष्टव्यं | 6 तयो
 र्भविष्यद्वाक्यकथनदिनेषु यथा वृष्टिर्न जायते तथा गगनं रोद्धुं तयोः सामर्थ्यम्
 अस्ति, अपरं तोयानि शोणितरूपाणि कर्तुं निजाभिलाषात् मुहुर्मुहुः
 सर्वविधदण्डैः पृथिवीम् आहन्तुञ्च तयोः सामर्थ्यमस्ति | 7 अपरं तयोः
 साक्ष्ये समाप्ते सति रसातलाद् येनोत्थितव्यं स पशुस्ताभ्यां सह युद्ध्वा
 तौ जेष्यति हनिष्यति य | (Abyssos g12) 8 ततस्तयोः प्रभुरपि यस्यां
 मडापुत्र्यां कुशो हतो ऽर्थतो यस्याः पारमार्थिकनामनी सिद्धोभं मिसरश्चेति
 तस्या मडापुत्र्याः सन्निवेशे तयोः कुण्डे स्थास्यतः | 9 ततो नानाजातीया
 नानावंशीया नानाभाषावादिनो नानादेशीयाश्च बहवो मानवाः सार्द्धदिनत्रयं
 तयोः कुण्डे निरीक्षिष्यन्ते, तयोः कुण्डपयोः श्मशाने स्थापनं नानुज्ञास्यन्ति |
 10 पृथिवीनिवासिनश्च तयो र्हतोरानन्दिष्यन्ति सुभभोगं कुर्वन्तः परस्परं
 दानानि प्रेषयिष्यन्ति य यतस्ताभ्यां भविष्यद्वादिभ्यां पृथिवीनिवासिनो
 यातनां प्राप्ताः | 11 तस्मात् सार्द्धदिनत्रयात् परम् ईश्वरात् ज्वनदायक
 आत्मनि तौ प्रविष्टे तौ यरणैरुदतिष्ठतां, तेन यावन्तस्तावपश्यन् ते ऽतीव
 त्रासयुक्ता अभवन् | 12 ततः परं तौ स्वर्गाद् उच्यैरिदं कथयन्तं रवम्
 अशृणुतां युवां स्थानम् अतद् आरोहतां ततस्तयोः शत्रुषु निरीक्षमाणेषु
 तौ मेघेन स्वर्गम् आरूढवन्तौ | 13 तद्दण्डे मडाभूमिकम्पे जाते पुत्र्या
 दशमांशः पतितः सप्तसहस्राणि मानुषाश्च तेन भूमिकम्पेन हताः,
 अवशिष्टाश्च भयं गत्वा स्वर्गायेश्वरस्य प्रशंसाम् अकीर्तयन् | 14
 द्वितीयः सन्तापो गतः पश्य तृतीयः सन्तापस्तूर्णम् आगच्छति | 15
 अनन्तरं सप्तदूतेन तूर्यां वादितायां स्वर्गं उच्यैः स्वर्वागियं कीर्त्तिता,

राजत्वं जगतो यधद् राज्यं तदधुनाभवत् | अस्मत्प्रभोस्तदीयाभिषिक्तस्य
तारकस्य य | तेन यानन्तकालीयं राजत्वं प्रकरिष्यते | | (aiōn g165) 16
अपरम् ईश्वरस्यान्तिके स्वडीयसिंहासनेषूपविष्टाश्रतुर्विंशतिप्राचीना भुवि
न्यङ्भूभा भूत्वेश्वरं प्राणभ्यावदन् 17 हे भूत वर्तमानापि भविष्यंश्च
परेश्वर | हे सर्वशक्तिमन् स्वामिन् वयं ते कुर्महे स्तवं | यत् त्वया
क्रियते राज्यं गृहीत्वा ते मडाभवं | 18 विजातीयेषु कुप्यत्सु प्रादुर्भूता तव
कुधा | मृतानामपि कालो ऽसौ विचारो भविता यदा | भृत्याश्च तव यावन्तो
भविष्यद्वाटिसाधवः | ये य क्षुद्रा मडान्तो वा नामतस्ते हि भिष्यति | यदा
सर्वोभ्य अतेभ्यो वेतनं वितरिष्यते | गन्तव्यश्च यदा नाशो वसुधाया
विनाशकैः | | 19 अनन्तरम् ईश्वरस्य स्वर्गस्थमन्दिरस्य द्वारं मुक्तं
तन्मन्दिरमध्ये य नियममञ्जूषा दृश्याभवत्, तेन तडितो रवाः स्तनितानि
भूमिकम्पो गुरुतरशिलावृष्टिश्चैतानि समभवन् |

12 ततः परं स्वर्गे मडायित्रं दृष्टं योषिटेकासीत् सा परिहितसूर्या
यन्द्रश्च तस्याश्चरणयोरधो द्वादशताराणां किरीटञ्च शिरस्यासीत् | 2
सा गर्भवती सती प्रसववेदनया व्यथितार्त्तरावम् अकरोत् | 3 ततः स्वर्गे
ऽपरम् अेकं यित्रं दृष्टं मडानाग अेक उपातिष्ठत् स लोहितवर्णस्तस्य
सप्त शिरांसि सप्त शृङ्गाणि शिरःसु य सप्त किरीटान्यासन् | 4
स स्वलाङ्गुलेन गगनस्थनक्षत्राणां तृतीयांशम् अवमृज्य पृथिव्यां
न्यपातयत् | स अेव नागो नवजातं सन्तानं ग्रसितुम् उधतस्तस्याः
प्रसविष्यमाणाया योषितो ऽन्तिके ऽतिष्ठत् | 5 सा तु पुंसन्तानं
प्रसूता स अेव लौहमयराजदण्डेन सर्वजातीश्वरयिष्यति, किञ्च तस्याः
सन्तान ईश्वरस्य समीपं तदीयसिंहासनस्य य सन्निधिम् उद्धृतः |
6 सा य योषित् प्रान्तरं पलायिता यतस्तत्रेश्वरेण निर्मित आश्रमे
षष्ठ्यधिकशतद्वयाधिकसहस्रदिनानि तस्याः पालनेन भवितव्यं | 7 ततः
परं स्वर्गे संग्राम उपापिष्ठत् भीष्मायेलस्तस्य दूताश्च तेन नागेन सहायुध्यन्
तथा स नागस्तस्य दूताश्च संग्रामम् अकुर्वन्, किन्तु प्रभवितुं नाशकुण्वन्
8 यतः स्वर्गे तेषां स्थानं पुनर्नाविधत् | 9 अपरं स मडानागो ऽर्थतो
दियावलः (अपवाटकः) शयतानश्च (विपक्षः) इति नाम्ना विष्यातो यः
पुरातनः सर्पः कृत्स्नं नरलोकं भ्रामयति स पृथिव्यां निपातितस्तेन साद्धं

तस्य दूता अपि तत्र निपातिताः । 10 ततः परं स्वर्गे उच्यैर्त्षिमाणो
 र्वो ऽयं मयाश्रावि, त्राणं शक्तिश्च राजत्वमधुनैवेश्वरस्य नः । तथा
 तेनाभिषिक्तस्य त्रातुः पराक्रमो ऽभवत् । यतो निपातितो ऽस्माकं भ्रातृणां
 सो ऽभियोजकः । येनेश्वरस्य नः साक्षात् ते ऽदूष्यन्त दिवानिशं । 11
 भेषवत्सस्य रक्तेन स्वसाक्ष्यवयनेन य । ते तु निर्जितवन्तस्तं न य स्नेहम्
 अकुर्वत् । प्राणोष्वपि स्वकीयेषु भरणस्यैव सङ्कटे । 12 तस्माद् आनन्दतु
 स्वर्गो हृष्यन्तां तन्निवाभिनः । ङा भूमिसागरौ तापो युवाभेवाकृमिष्यति ।
 युवयोरवतीर्णो यत् शैतानो ऽतीव कापनः । अल्पो मे समयो ऽस्त्येतस्यापि
 तेनावगम्यते । 13 अनन्तरं स नागः पृथिव्यां स्वं निक्षिप्तं विलोक्य
 तां पुत्रप्रसूतां योषितम् उपाद्रवत् । 14 ततः सा योषित् यत् स्वकीयं
 प्रान्तरस्थाश्रमं प्रत्युत्पतितुं शक्नुयात् तदर्थं मङ्कुररस्य पक्षद्वयं तस्यै
 दत्तं, सा तु तत्र नागतो दूरे कालैकं कालद्वयं कालार्द्धञ्च यावत् पाल्यते । 15
 किञ्च स नागस्तां योषितं स्रोतसा प्लावयितुं स्वमुभात् नदीवत् तोयानि
 तस्याः पश्चात् प्राक्षिपत् । 16 किन्तु मेदिनी योषितम् उपकुर्वती निजवदनं
 व्याधाय नागमुभाद् उद्गीर्णां नदीम् अपिवत् । 17 ततो नागो योषिते कुट्ट्या
 तद्वंशस्यावशिष्टलोकैरर्थतो य एश्वरस्याज्ञाः पालयन्ति यीशोः साक्ष्यं
 धारयन्ति य तैः सह योद्धुं निर्गतवान् ।

13 ततः परमं सागरीयसिकतायां तिष्ठन् सागराद् उद्गच्छन्तम् अकं पशुं
 दृष्टवान् तस्य दश शृङ्गाणि सप्त शिरांसि य दश शृङ्गेषु दश किरीटानि शिरःसु
 येश्वरनिन्दासूयकानि नामानि विधन्ते । 2 मया दृष्टः स पशुश्चित्रव्याघ्रसदृशः
 किन्तु तस्य यराणौ भल्लूकस्यैव वदनञ्च सिंहावनमिव । नागने
 तस्मै स्वीयपराक्रमः स्वीयं सिंहासनं मलाधिपत्यञ्चादायि । 3 मयि
 निरीक्षमाणो तस्य शिरसाम् अकम् अन्तकाघातेन छेदितमिवादृश्यत्,
 किन्तु तस्यान्तकक्षतस्य प्रतीकारो ऽक्रियत् ततः कृत्स्नो नरलोकस्तं पशुमधि
 यमत्कारं गतः, 4 यश्च नागस्तस्मै पशवे सामर्थ्यं दत्तवान् सर्वो तं प्राणमन्
 पशुमपि प्राणमन्तो ऽकथयन्, को विधते पशोस्तुल्यस्तेन को योद्धुमर्हति । 5
 अनन्तरं तस्मै दर्षवाक्येश्वरनिन्दावादि वदनं द्वियत्वारिंशन्मासान् यावद्
 अवस्थितेः सामर्थ्यञ्चादायि । 6 ततः स एश्वरनिन्दनार्थं मुषं व्याधाय तस्य
 नाम तस्यावासं स्वर्गनिवासिनश्च निन्दितुम् आरभत । 7 अपरं धार्मिकैः

सह योधनस्य तेषां पराजयस्य यानुमतिः सर्व्वज्जातीयानां सर्व्ववंशीयानां
सर्व्वभाषावादिनां सर्व्वदेशीयानां आधिपत्यमपि तस्मा अदायि | 8 ततो
जगतः सृष्टिकाळात् छेदितस्य भेषवत्सस्य ज्वनपुस्तके यावतां नामानि
लिभितानि न विधन्ते ते पृथिवीनिवासिनः सर्व्वे तं पशुं प्राणंस्यन्ति | 9
यस्य श्रोत्रं विधत्ते स शृणोतु | 10 यो जनो ऽपरान् वन्दीकृत्य नयति स
स्वयं वन्दीभूय स्थानान्तरं गमिष्यति, यश्च ञ्जेन ऽन्ति स स्वयं ञ्जेन
घानिष्यते | अत्र पवित्रलोकानां सङ्घिषुतया विश्वासेन य प्रकाशितव्यं |
11 अनन्तरं पृथिवीत उद्गच्छन् अपर अेकः पशु र्भया दृष्टः स भेषशावको
शृङ्गद्वयविशिष्ट आसीत् नागवय्याभाषत | 12 स प्रथमपशोरन्तिके तस्य
सर्व्वं पराङ्गं व्यवहरति विशेषतो यस्य प्रथमपशोरन्तिकक्षतं प्रतीकारं
गतं तस्य पूजां पृथिवीं तन्निवासिनश्च कारयति | 13 अपरं मानवानां
साक्षाद् आकाशतो भुवि वह्निवर्षणादीनि भडायित्राणि करोति | 14
तस्य पशोः साक्षाद् येषां चित्रकर्माणां साधनाय सामर्थ्यं तस्मै दत्तं तैः
स पृथिवीनिवासिनो ब्रामयति, विशेषतो यः पशुः ञ्जेन क्षतयुक्तो
भूत्वाप्यज्वत् तस्य प्रतिमानिर्भाषां पृथिवीनिवासिन आदिशति | 15
अपरं तस्य पशोः प्रतिमा यथा भाषते यावन्तश्च मानवास्तां पशुप्रतिमां न
पूजयन्ति ते यथा ऽन्यन्ते तथा पशुप्रतिमायाः प्राणप्रतिष्ठार्थं सामर्थ्यं तस्मा
अदायि | 16 अपरं क्षुद्रमडद्वनिदरिद्रमुक्तदासान् सर्व्वान् दक्षिणकरे भाले
वा कलङ्कं ग्राहयति | 17 तस्माद् ये तं कलङ्कमर्थतः पशो र्नाम तस्य नाम्नः
संख्याङ्कं वा धारयन्ति तान् विना परेण केनापि क्यविक्रये कर्तुं न शक्येते |
18 अत्र ज्ञानेन प्रकाशितव्यं | यो बुद्धिविशिष्टः स पशोः संख्यां गणयतु
यतः सा मानवस्य संख्या भवति | सा य संख्या षट्षष्ट्यधिकषट्शतानि |

14 ततः परं निरीक्षमाणेन मया भेषशावको दृष्टः स
सियोनपर्व्वतस्योपर्य्यतिष्ठत्, अपरं येषां भालेषु तस्य नाम तत्पितुश्च नाम
लिभितमास्ते तादृशाश्चतुश्चत्वारिंशत्सहस्राधिका लक्षलोकान्तेन सार्द्धम्
आसन् | 2 अनन्तरं बहुतोयानां रव षव गुरुतरस्तनितस्य च रव षव
अेको रवः स्वर्गात् मयाश्रावि | मया श्रुतः स रवो वीणावादनानां
वीणावादनस्य सदृशः | 3 सिंहासनस्यान्तिके प्राणियतुष्टयस्य
प्राचीनवर्गस्य यान्तिके ऽपि ते नवीनमेकं गीतम् अगायन् किन्तु धरणीतः

પરિક્રીતાન્ તાન્ ચતુશ્રત્વારિંશત્યહસ્રાધિકલક્ષલોકાન્ વિના નાપરેણ
 કેનાપિ તદ્ ગીતં શિક્ષિતું શક્યતે | 4 ઇમે યોષિતાં સર્જેન ન કલહ્નિતા યતસ્તે
 ડમૈથુના મેષશાવકો યત્ કિમપિ સ્થાનં ગચ્છેત્ તત્સર્વ્વસ્મિન્ સ્થાને તમ્
 અનુગચ્છન્તિ યતસ્તે મનુષ્યાણાં મધ્યતઃ પ્રથમફલાનીવેશ્વરસ્ય
 મેષશાવકસ્ય ચ કૃતે પરિક્રીતાઃ | 5 તેષાં વદનેષુ યાનૃતં કિમપિ ન વિધતે
 યતસ્તે નિર્દોષા ઇશ્વરસિંહાસનસ્યાન્તિકે તિષ્ઠન્તિ | 6 અનન્તરમ્
 આકાશમધ્યેનોઢીયમાનો ડપર એકો દૂતો મયા દૃષ્ટઃ સો ડનન્તકાલીયં
 સુસંવાદં ધારયતિ સ ચ સુસંવાદઃ સર્વ્વજાતીયાન્ સર્વ્વવંશીયાન્
 સર્વ્વભાષાવાદિનઃ સર્વ્વદેશીયાંશ્ર પૃથિવીનિવાસિનઃ પ્રતિ તેન ઘોષિતવ્યઃ |
 (aiōnios g166) 7 સ ઉચ્ચૈઃસ્વરેણેદં ગદતિ યૂયમીશ્વરાદ્ બિભીત તસ્ય સ્તવં
 કુરુત ચ યતસ્તદીયવિચારસ્ય દણ્ડ ઉપાતિષ્ઠત્ તસ્માદ્ આકાશમાણ્ડલસ્ય
 પૃથિવ્યાઃ સમુદ્રસ્ય તોયપ્રસ્રવણાનાઞ્ર ઞ્રષ્ટા યુષ્માભિઃ પ્રણમ્યતાં | 8
 તત્પશ્ચાદ્ દ્વિતીય એકો દૂત ઉપસ્થાયાવદત્ પતિતા પતિતા સા મહાબાબિલ્
 યા સર્વ્વજાતીયાન્ સ્વકીયં વ્યભિચારરૂપં ક્રોધમદમ્ અપાયયત્ | 9
 તત્પશ્ચાદ્ તૃતીયો દૂત ઉપસ્થાયોચ્ચૈરવદત્, યઃ કશ્ચિત તં શશું તસ્ય
 પ્રતિમાઞ્ર પ્રણમતિ સ્વભાલે સ્વકરે વા કલહ્નું ગૃહ્ણાતિ ચ 10 સો ડપીશ્વરસ્ય
 ક્રોધપાત્રે સ્થિતમ્ અમિશ્રિતં મદત્ અર્થત ઇશ્વરસ્ય ક્રોધમદં પાસ્યતિ
 પવિત્રદૂતાનાં મેષશાવકસ્ય ચ સાક્ષાદ્ વહ્નિગન્ધકયો ર્યાતનાં લપ્સ્યતે ચ |
 11 તેષાં યાતનાયા ધૂમો ડનન્તકાલં યાવદ્ ઉદ્ભિષ્યતિ યે ચ પશું તસ્ય
 પ્રતિમાઞ્ર પૂજયન્તિ તસ્ય નામ્નો ડહ્નું વા ગૃહ્ણન્તિ તે દિવાનિશં કઞ્રન વિરામં
 ન પ્રાપ્સ્યન્તિ | (aiōn g165) 12 યે માનવા ઇશ્વરસ્યાજ્ઞા યીશૌ વિશ્વાસઞ્ર
 પાલયન્તિ તેષાં પવિત્રલોકાનાં સહિષ્ણુતયાત્ર પ્રકાશિતવ્યં | 13 અપરં
 સ્વર્ગાત્ મયા સહ સમ્ભાષમાણ એકો રવો મયાશ્રાવિ તેનોક્તં ત્વં લિખ,
 ઇદાનીમારભ્ય યે પ્રભૌ મિયન્તે તે મૃતા ધન્યા ઇતિ; આત્મા ભાષતે સત્યં
 સ્વશ્રમેભ્યસ્તૈ વિરામઃ પ્રાપ્તવ્યઃ તેષાં કર્માણિ ય તાન્ અનુગચ્છન્તિ | 14
 તદનન્તરં નિરીક્ષમાણેન મયા શ્વેતવર્ણ એકો મેઘો દૃષ્ટસ્તન્મેઘારૂઢો જનો
 માનવપુત્રાકૃતિરસ્તિ તસ્ય શિરસિ સુવર્ણકિરીટં કરે ચ તીક્ષણં દાત્રં તિષ્ઠતિ |
 15 તતઃ પરમ્ અન્ય એકો દૂતો મન્દિરાત્ નિર્ગત્યોચ્ચૈઃસ્વરેણ તં મેઘારૂઢં
 સમ્ભાષ્યાવદત્ ત્વયા દાત્રં પ્રસાર્ચ્ય શસ્યચ્છેદનં ક્રિયતાં શસ્યચ્છેદનસ્ય

समय उपस्थितो यतो भेदिन्याः शस्यानि परिपक्कानि। 16 ततस्तेन
 मेघाउठेन पृथिव्यां दात्रं प्रसार्य पृथिव्याः शस्यच्छेदनं कृतं। 17 अनन्तरम्
 अपर ओको दूतः स्वर्गस्थमन्दिरात् निर्गतः सो ऽपि तीक्ष्णं दात्रं धारयति।
 18 अपरम् अन्य ओको दूतो वेदितो निर्गतः स वह्नेरधिपतिः स उच्यैःस्वरेण
 तं तीक्ष्णदात्रधारिणं सम्भाष्यावदत् त्वया स्वं तीक्ष्णं दात्रं प्रसार्य भेदिन्या
 द्राक्षागुच्छच्छेदनं क्रियतां यतस्तत्फलानि परिणतानि। 19 ततः स दूतः
 पृथिव्यां स्वदात्रं प्रसार्य पृथिव्या द्राक्षाङ्गलच्छेदनम् अकरोत् तत्फलानि
 येश्वरस्य क्रोधस्वरूपस्य मङ्गाकुण्डस्य मध्यं निरक्षिपत्। 20
 तत्कुण्डस्थङ्गलानि य षड्भिर्भेदितानि ततः कुण्डमध्यात् निर्गतं रक्तं
 क्रोशशतपर्यन्तम् अश्वानां षलीनान् यावद् व्याप्नोत्।

15 ततः परम् अहं स्वर्गं ऽपरम् ओकम् अद्भुतं मङ्गायिहं दृष्टवान् अर्थतो
 यैर्दात्रैरीश्वरस्य कोपः समाप्तिं गमिष्यति तान् दात्रान् धारयन्तः सप्त
 दूता मया दृष्टाः। 2 वह्निमिश्रितस्य कायमयस्य जलाशयस्याकृतिरपि
 दृष्टा ये य पशोस्तत्प्रतिमायास्तन्नाम्नो ऽङ्गस्य य प्रभूतवन्तस्ते
 तस्य कायमयजलाशयस्य तीरे तिष्ठन्त इश्वरीयवीणा धारयन्ति, 3
 इश्वरदासस्य मूससो गीतं मेषशावकस्य य गीतं गायन्तो वदन्ति, यथा,
 सर्वशक्तिविशिष्टत्वं हे प्रभो परमेश्वर। त्वदीयसर्वकर्माणि मङ्गान्ति
 याद्भुतानि य। सर्वपुण्यवतां राजन् मार्गा न्याय्या ऋताश्च ते। 4
 हे प्रभो नामधेयात्ते को न भीतिं गमिष्यति। को वा त्वदीयनाम्नश्च
 प्रशंसां न करिष्यति। केवलस्त्वं पवित्रो ऽसि सर्वजातीयमानवाः।
 त्वाभेवाभिप्रायंस्वन्ति समागत्य त्वदन्तिकं। यस्मात्तव विचारज्ञाः प्रादुर्भावं
 गताः किल। 5 तदनन्तरं मयि निरीक्षमाणो सति स्वर्गं साक्ष्यावासस्य
 मन्दिरस्य द्वारं मुक्तं। 6 ये य सप्त दूताः सप्त दात्रान् धारयन्ति ते तस्मात्
 मन्दिरात् निरगच्छन्। तेषां परिच्छेदा निर्भलशृङ्खलावर्णवस्त्रनिर्मिता
 वक्षांसि य सुवर्णशृङ्खला वैष्टितान्यासन्। 7 अपरं यतुर्णां प्राणिनाम्
 अकस्तेभ्यः सप्तदूतेभ्यः सप्तसुवर्णकंसान् अददात्। (aiōn g165) 8
 अनन्तरम् इश्वरस्य तेजःप्रभावकारणात् मन्दिरं धूमेन परिपूर्णं तस्मात् तैः
 सप्तदूतैः सप्तदात्रानां समाप्तिं यावत् मन्दिरं केनापि प्रवेष्टुं नाशक्यत।

16 ततः परं मन्दिरात् तान् सप्तदूतान् सम्भाषमाण् अेष महारवो मयाश्रावि, यूयं गत्वा तेभ्यः सप्तकंसेभ्य एश्वरस्य क्रोधं पृथिव्यां स्त्रावयत | 2 ततः प्रथमो दूतो गत्वा स्वकंसे यधद् अविधत तत् पृथिव्याम् अस्त्रावयत् तस्मात् पशोः कलङ्कधारिणां तत्प्रतिमापूजकानां मानवानां शरीरेषु व्यथाजनका दृष्टव्राणा अभवन् | 3 ततः परं द्वितीयो दूतः स्वकंसे यधद् अविधत तत् समुद्रे स्त्रावयत् तेन स कुलापस्थशोणितरूप्यभवत् समुद्रे स्थिताश्च सर्व्यं प्राणिनो मृत्युं गताः | 4 अपरं तृतीयो दूतः स्वकंसे यधद् अविधत तत् सर्व्यं नदीषु जलप्रस्रवणेषु यास्त्रावयत् ततस्तानि रक्तमयान्यभवन् | अपरं तोयानाम् अधिपस्य दूतस्य वागियं मया श्रुता | 5 वर्तमानश्च भूतश्च भविष्यंश्च परमेश्वरः | त्वमेव न्याय्यकारी यद् अेतादृक् त्वं व्यारयः | 6 भविष्यद्वादिसाधूनां रक्तं तैरेव पातितं | शोणितं त्वन्तु तेभ्यो ददास्तत्मानं तेषु युज्यते | 7 अनन्तरं वेदीतो भाषमाणस्य कस्यचिद् अयं रवो मया श्रुतः, हे परेश्वर सत्यं तत् हे सर्व्यशक्तिमन् प्रभो | सत्या न्याय्याश्च सर्व्या हि वियाराज्ञास्त्वदीयकाः | 8 अनन्तरं यतुर्थो दूतः स्वकंसे यधद् अविधत तत् सर्व्यं सूर्य्ये स्त्रावयत् तस्मै य वह्निना मानवान् दग्धुं सामर्थ्यम् अदायि | 9 तेन मनुष्या महातापेन तापितास्तेषां दण्डानाम् आधिपत्यविशिष्टेश्वरस्य नामानिन्दन् तत्प्रशंसार्थञ्च मनःपरिवर्तनं नाकुर्वन् | 10 ततः परं पञ्चमो दूतः स्वकंसे यधद् अविधत तत् सर्व्यं पशोः सिंहासने स्त्रावयत् तेन तस्य राष्ट्रं तिमिराच्छन्नम् अभवत् लोकाश्च वेदनाकारणात् स्वरसना अदंशयत् | 11 स्वकीयव्यथाप्राणकारणाच्च स्वर्गस्थम् अनिन्दन् स्वक्रियाभ्यश्च मनांसि न परावर्तयन् | 12 ततः परं षष्ठो दूतः स्वकंसे यधद् अविधत तत् सर्व्यं इराताप्यो महानदे स्त्रावयत् तेन सूर्य्योदयदिश आगमिष्यतां राज्ञां मार्गसुगमार्थं तस्य तोयानि पर्य्यशुष्यन् | 13 अनन्तरं नागस्य वदनात् पशो र्वदनात् मिथ्याभविष्यद्वादिनश्च वदनात् निर्गच्छन्तस्त्रयो दशुयय आत्मानो मया दृष्टास्ते मण्डूकाकाराः | 14 त आश्चर्य्यकर्मकारिणो भूतानाम् आत्मानः सन्ति सर्व्यशक्तिमत एश्वरस्य महादिने येन युद्धेन भवितव्यं तत्कृते कृत्स्नजगतो राज्ञाः संग्रहीतुं तेषां सन्निधिं निर्गच्छन्ति | 15 अपरम् एभिर्भाषया ळर्मगिदोनामकस्थने ते सङ्गृहीताः | 16 पश्याहं यैरवद् आगच्छामि यो जनः प्रबुद्धस्तिष्ठति यथा य

नग्नः सन् न पर्यटति तस्य लज्जा य यथा दृश्या न भवति तथा स्ववासांसि रक्षति स धन्यः | 17 ततः परं सप्तमो दूतः स्वकंसे यधद् अविधत तत् सर्व्वम् आकाशे ऽस्त्रावयत् तेन स्वर्गीयमन्दिरमध्यस्थसिंहासनात् महारवो ऽयं निर्गतः समाप्तिरभवदिति | 18 तदनन्तरं तडितो रवाः स्तनितानि याभवन्, यस्मिन् काले य पृथिव्यां मनुष्याः सृष्टास्तम् आरभ्य यादृङ्खलाभूमिकम्पः कदापि नाभवत् तादृग् भूकम्पो ऽभवत् | 19 तदानीं मडानगरी त्रिभण्डा जाता भिन्नजातीयानां नगराणि य न्यपतन् मडाभाबिल् येश्वरेण स्वकीयप्रयण्डकोपमदिरापात्रदानार्थं संस्मृता | 20 द्वीपाश्च पलायिता गिरयश्चान्तहिताः | 21 गगनमण्डलाय्य मनुष्याणाम् उपर्य्यैकैकद्रोणपरिमितशिलानां मडावृष्टिरभवत् तच्छिलावृष्टेः क्लेशात् मनुष्या ईश्वरम् अनिन्दम् यतस्तज्जातः क्लेशो ऽतीव मडान् |

17 तदनन्तरं तेषां सप्तकंसधारिणां सप्तदूतानाम् अेक आगत्य मां सम्भाष्यावदत्, अत्रागच्छ, मेदिन्या नरपतयो यया वेश्यया सार्द्धं व्यभियारकर्म्म कृतवन्तः, 2 यस्या व्यभियारमदेन य पृथिवीनिवासिनो मत्ता अभवन् तस्या बहुतोयेषूपविष्टाया मडावेश्याया दण्डम् अहं त्वां दर्शयामि | 3 ततो ऽहम् आत्मनाविष्टस्तेन दूतेन प्रान्तरं नीतस्तत्र निन्दानामभिः परिपूर्णां सप्तशिरोभिर् ईशशृङ्गैश्च विशिष्टं सिन्दूरवर्णां पशुमुपविष्टा योषिदेका मया दृष्टा | 4 सानारी कृष्णलोहितवर्णां सिन्दूरवर्णां परिच्छदं धारयति स्वार्णभण्डिमुक्ताभिश्च विभूषितास्ति तस्याः करे धृष्टार्द्धद्रव्यैः स्वव्यभियारजातमलैश्च परिपूर्णां अेकः सुवर्णमयः कंसो विधते | 5 तस्या भाले निगूढवाक्यमिदं पृथिवीस्थवेश्यानां धृष्टयक्रियाणाञ्च माता मडाभाबिलिति नाम लिभितम् आस्ते | 6 मम दृष्टिगोचरस्था सा नारी पवित्रलोकानां रुधिरेण यीशोः साक्षिणां रुधिरेण य मत्तासीत् तस्या दर्शनात् ममातिशयम् आश्चर्य्यज्ञानं जातं | 7 ततः स दूतो माम् अवदत् कुतस्तवाश्चर्य्यज्ञानं जायते? अस्या योषितस्तद्वाहनस्य सप्तशिरोभिर् ईशशृङ्गैश्च युक्तस्य पशोश्च निगूढभावम् अहं त्वां ज्ञापयामि | 8 त्वया दृष्टो ऽसौ पशुरासीत् नेदानीं वर्त्तते किन्तु रसातलात् तेनोदितव्यं विनाशश्च गन्तव्यः | ततो येषां नामानि जगतः सृष्टिकालम् आरभ्य ज्वनपुस्तके लिभितानि न विधन्ते ते पृथिवीनिवासिनो भूतम् अवर्त्तमानमुपस्थास्यन्तञ्च

तं पशुं दृष्ट्वाश्चर्यं भंस्यन्ते। (Abyssos g12) 9 अत्र ज्ञानयुक्तया बुद्ध्या
 प्रकाशितव्यं। तानि सप्तशिरांसि तस्या योषित उपवेशनस्थानस्वरूपाः
 सप्तगिरयः सप्त राजानश्च सन्ति। 10 तेषां पञ्च पतिता अेकश्च वर्तमानः
 शेषश्चाधाप्यनुपस्थितः स यदोपस्थास्यति तदापि तेनाल्पकालं स्थातव्यं।
 11 यः पशुरासीत् किन्त्विदानीं न वर्तते स अेवाष्टमः, स सप्तानाम्
 अेको ऽस्ति विनाशं गमिष्यति य। 12 त्वया दृष्टानि दशशृङ्गाण्यपि
 दश राजानः सन्ति, अधापि तै राज्यं न प्राप्तं किन्तु मुहूर्त्तभेदं यावत्
 पशुना साद्धं ते राजान एव प्रभुत्वं प्राप्स्यन्ति। 13 त अेकमन्त्रेण
 भविष्यन्ति स्वकीयशक्तिप्रभावौ पशवे दास्यन्ति य। 14 ते मेषशावकेन
 साद्धं योत्स्यन्ति, किन्तु मेषशावकस्तान् जेष्यति यतः स प्रभूनां प्रभू राज्ञां
 राजा यास्ति तस्य सङ्गिनो ऽप्याडूता अभिरुचिता विश्वास्याश्च। 15
 अपरं स माम् अवदत् सा वेश्या यत्रोपविशति तानि तोयानि लोका जनता
 जातयो नानाभाषावादिनश्च सन्ति। 16 त्वया दृष्टानि दश शृङ्गाणि पशुश्रुमे
 तां वेश्याम् ऋतीधिष्यन्ते दीनां नग्नाञ्च करिष्यन्ति तस्या मांसानि भोक्ष्यन्ते
 वह्निना तां दाड्यिष्यन्ति य। 17 यत ईश्वरस्य वाक्यानि यावत् सिद्धिं न
 गमिष्यन्ति तावद् ईश्वरस्य मनोगतं साधयितुम् अेकां मन्त्रेण कृत्वा तस्मै
 पशवे स्वेषां राज्यं दातुञ्च तेषां मनांसीश्वरेण प्रवर्तितानि। 18 अपरं
 त्वया दृष्टा योषित् सा मखानगरी या पृथिव्या राज्ञाम् उपरि राजत्वं कुरुते।

18 तदनन्तरं स्वर्गाद् अवरोहन् अपर अेको दूतो मया दृष्टः स
 मखापराक्रमविशिष्टस्तस्य तेजसा य पृथिवी दीप्ता। 2 स बलवता
 स्वरेण वायमिमाम् अधोषयत् पतिता पतिता मखाभाबिल, सा भूतानां
 वसतिः सर्वेषाम् अशुभ्यात्मनां कारा सर्वेषाम् अशुभीनां घृणयानाञ्च
 पक्षिणां पिञ्जरश्चाभवत्। 3 यतः सर्वजतीयास्तस्या व्यभियारजातां
 कोपमदिरां पीतवन्तः पृथिव्या राजानश्च तथा सड व्यभियारं कृतवन्तः
 पृथिव्या वणिजश्च तस्याः सुभ्रभोगबाहुल्याद् धनाढ्यतां गतवन्तः।
 4 ततः परं स्वर्गात् मयापर ओष रवः श्रुतः, हे मम प्रजाः, यूयं यत्
 तस्याः पापानाम् अंशिनो न भवत तस्या दण्डैश्च दण्डयुक्ता न भवत
 तदर्थं ततो निर्गच्छत। 5 यतस्तस्याः पापानि गगनस्पर्शान्यभवन् तस्या
 अधर्माक्रियाश्चेश्वरेण संस्मृताः। 6 परान् प्रति तथा यद्धद् व्यवहृतं तद्धत्

तां प्रति व्यवहरत, तस्याः कर्माणां द्विगुणफलानि तस्यै दत्त, यस्मिन् कसे
 सा परान् मधम् अपाययत् तमेव तस्याः पानार्थं द्विगुणमधेन पूरयत् |
 7 तथा यात्मश्लाघा यश्च सुभभोगः कृतस्तयो द्विगुणौ यातनाशोकी
 तस्यै दत्त, यतः सा स्वकीयान्तःकरणे वदति, राजीवद् उपविष्टा नानाथा
 न य शोकवित् | 8 तस्माद् द्विवस अकस्मिन् मारीदुर्भिक्षशोचनेः, सा
 समाप्नोष्यते नारी धक्ष्यते वह्निना य सा; यद् विचारधिपस्तस्या बलवान्
 प्रभुरीश्वरः, 9 व्यभियारस्तया साद्धं सुभभोगश्च यैः कृतः, ते सर्व्वे अवे
 राजानस्तदाडधूमदर्शनात्, प्ररोटिष्यन्ति वक्षांसि याडनिष्यन्ति बाडुभिः |
 10 तस्यास्तै र्यातनाभीते दूरे स्थित्वेदमुच्यते, डा डा बाबिल् मडास्थान डा
 प्रभावान्विते पुरि, अकस्मिन् आगता दएडे विचाराज्ञा त्वदीयका | 11
 मेदिन्या वणिजश्च तस्याः कृते रुदन्ति शोचन्ति य यतस्तेषां पाण्यद्रव्याणि
 केनापि न कीयन्ते | 12 इलतः सुवार्णरौप्यमणिमुक्ताः सूक्ष्मवस्त्राणि
 कृष्णलोडितवासांसि पट्टवस्त्राणि सिन्दूरवर्णवासांसि यन्दनाटिकाष्ठानि
 गजदन्तेन मडार्धकाष्ठेन पित्तललौडाभ्यां भर्भरप्रस्तरेण वा निर्मितानि
 सर्व्वविधापात्राणि 13 त्वगेला धूपः सुगन्धिद्रव्यं गन्धरसो द्राक्षारसस्तैलं
 शस्ययूर्णं गोधूमो गावो भेषा अशवा रथा दासेया मनुष्यप्राणाश्चैतानि
 पाण्यद्रव्याणि केनापि न कीयन्ते | 14 तव मनोडमिलाषस्य इलानां समयो
 गतः, त्वत्तो दूरीकृतं यधत् शोभनं लूषाणं तव, कदायन तद्दुदेशो न पुन
 र्दप्यते त्वया | 15 तद्विक्रितारो ये वणिजस्तया धनिनो जातास्ते तस्या
 यातनाया भयाद् दूरे तिष्ठन्तो रोटिष्यन्ति शोचन्तश्चेदं गटिष्यन्ति 16 डा डा
 मडापुरि, त्वं सूक्ष्मवस्त्रैः कृष्णलोडितवस्त्रैः सिन्दूरवर्णवासोभिश्चायथादिता
 स्वर्णमणिमुक्ताभिरलङ्कृता यासीः, 17 किन्त्वेकस्मिन् दएडे सा मडासम्पद्
 लुप्ता | अपरं पोतानां कर्णधाराः समूडलोका नाविकाः समुद्रव्यवसायिनश्च
 सर्व्वे 18 दूरे तिष्ठन्तस्तस्या दाडस्य धूमं निरीक्षमाणा उच्यैःस्वरेण वदन्ति
 तस्या मडानगर्याः किं तुल्यं? 19 अपरं स्वशिरःसु मृत्तिकां निक्षिप्य ते रुदन्तः
 शोचन्तश्चोच्यैःस्वरेण वदन्ति डा डा यस्या मडापुर्या बाडुल्यधनकारणात्,
 सम्पत्तिः सञ्चिता सर्व्वैः सामुद्रपोतनायकैः, अकस्मिन्नेव दएडे सा
 सम्पूर्णोच्छिन्नतां गता | 20 हे स्वर्गवासिनः सर्व्वे पवित्राः प्रेरिताश्च हे | हे
 भाविवादिनो यूयं कृते तस्याः प्रदर्षत | युष्माकं यत् तथा साद्धं यो विवादः

पुराभवत् | दण्डं समुचितं तस्य तस्यै व्यतरदीश्वरः | | 21 अनन्तरम्
 अको बलवान् दूतो बृहत्पेषणीप्रस्तरतुल्यं पाषाणमेकं गृहीत्वा समुद्रे
 निक्षिप्य कथितवान्, षट्पदप्रकाशेन बाबिल् मडानगरी निपातयिष्यते
 ततस्तस्या उद्देशः पुनर्न लप्स्यते | 22 वल्लकीवादिनां शब्दं पुनर्न श्रोष्यते
 त्वयि | गाथाकानाञ्च शब्दो वा वंशीतूर्यादिवादिनां | शिल्पकर्मकरः को
 ऽपि पुनर्न द्रक्ष्यते त्वयि | पेषणीप्रस्तरध्वानः पुनर्न श्रोष्यते त्वयि |
 23 दीपस्यापि प्रभा तद्वत् पुनर्न द्रक्ष्यते त्वयि | न कन्यावरयोः शब्दः
 पुनः संश्रोष्यते त्वयि | यस्मान्भुष्याः पृथिव्या ये वणिजस्तेऽभवन् तव |
 यस्माच्च जातयः सर्वा मोहितास्तव मायया | 24 भाविवादिपवित्राणां
 यावन्तश्च इता भुवि | सर्वेषां शोणितं तेषां प्राप्तं सर्वं तवान्तरे | |

19 ततः परं स्वर्गस्थानां मडाजनताया मडाशब्दो ऽयं मया श्रुतः,
 भूत परेश्वरं धन्यम् अस्मदीयो य एश्वरः | तस्याभवत् परित्राणां
 प्रभावश्च पराक्रमः | 2 विद्याराज्ञाश्च तस्यैव सत्या न्याय्या भवन्ति य |
 या स्ववेश्याक्रियाभिश्च व्यकरोत् कृत्स्नमेदिनी | तां स दण्डितवान् वेश्यां
 तस्याश्च करतस्तथा | शोणितस्य स्वदासानां संशोधं स गृहीतवान् | |
 3 पुनरपि तैरिदमुक्तं यथा, भूत परेश्वरं धन्यं यन्नित्यं नित्यमेव य |
 तस्या दास्य धूमो ऽसौ दिशमूर्द्ध्वमुद्देश्यति | | (aiōn g165) 4 ततः
 परं यतुर्विशतिप्राथीनाश्चत्वारः प्राणिनश्च प्रणिपत्य सिंहासनोपविष्टम्
 एश्वरं प्राणभ्यावदन्, तथास्तु परमेशश्च सर्वैरेव प्रशस्यतां | | 5 अनन्तरं
 सिंहासनमध्याद् अेष रवो निर्गतो, यथा, हे एश्वरस्य दासेयास्तद्भक्ताः
 सकला नराः | यूयं क्षुद्रा मडान्तश्च प्रशंसत व एश्वरं | | 6 ततः परं
 मडाजनतायाः शब्द एव बहुतोयानाञ्च शब्द एव गृरुतरस्तनितानाञ्च
 शब्द एव शब्दो ऽयं मया श्रुतः, भूत परेश्वरं धन्यं राजत्वं प्राप्तवान्
 यतः | स परमेश्वरो ऽस्माकं यः सर्वशक्तिमान् प्रभुः | 7 कीर्त्यामः स्तवं
 तस्य हृष्टाश्रोल्लासिता वयं | यन्मेषशावकस्यैव विवाहसमयो ऽभवत् |
 वाग्दत्ता याभवत् तस्मै या कन्या सा सुसज्जिता | 8 परिधानाय तस्यै
 य दत्तः शुभ्रः सुयेलकः | | 9 स सुयेलकः पवित्रलोकानां पुण्यानि |
 ततः स माम् उक्तवान् त्वमिदं लिप् मेषशावकस्य विवाहभोज्याय
 ये निमन्त्रितास्ते धन्या एति | पुनरपि माम् अवदत्, इमानीश्वरस्य

सत्यानि वाक्यानि | 10 अनन्तरं अहं तस्य यरायोरन्तिके निपत्य तं
 प्राणन्तुमुधतः | ततः स माम् उक्तवान् सावधानस्तिष्ठ मैवं कुरु थीशोः
 साक्ष्यविशिष्टैस्तव भ्रातृभिस्त्वया य सडदासो ऽहं | ईश्वरमेव प्राणम
 यस्माद् थीशोः साक्ष्यं भविष्यद्वाक्यस्य सारं | 11 अनन्तरं मया मुक्तः
 स्वर्गो दृष्टः, अेकः श्वेतवर्णो ऽश्वो ऽपि दृष्टस्तदाऽदो जनों विश्वास्यः
 सत्यमयश्चेति नाम्ना ष्यातः स याथार्थ्येन वियारं युद्धं करोति | 12
 तस्य नेत्रे ऽग्निशिखातुल्ये शिरसि य बहुकिरीटानि विधन्ते तत्र तस्य
 नाम लिपितमस्ति तमेव विना नापरः को ऽपि तन्नाम जानाति | 13 स
 रुधिरमग्नेन परिच्छेदेनाच्छादित ईश्वरवाह इति नाम्नाभिधीयते य | 14
 अपरं स्वर्गस्थसैन्यानि श्वेताश्वाऽद्वानि परिहितनिर्भलश्वेतसूक्ष्मवस्त्राणि
 य भूत्वा तमनुगच्छन्ति | 15 तस्य वक्त्राद् अेकस्तीक्ष्णः भङ्गो निर्गच्छति
 तेन भङ्गेन सर्वजातीयास्तेनाघातितव्याः स य लौहदण्डेन तान् यारथिष्यति
 सर्वशक्तिमत ईश्वरस्य प्रयाऽऽकोपरसोत्पादकद्राक्षाकुण्डे यधत् तिष्ठति
 तत् सर्वं स अेव पदाभ्यां पिनष्टि | 16 अपरं तस्य परिच्छेद उरसि य
 राज्ञां राजा प्रभूनां प्रभुश्चेति नाम निपितमस्ति | 17 अनन्तरं सूर्यं तिष्ठन्
 अेको दूतो मया दृष्टः, आकाशमध्य उड्डीयमानान् सर्वान् पक्षिणः प्रति स
 उच्यैःस्वरेणैहं घोषयति, अत्रागच्छत | 18 ईश्वरस्य महाभोज्ये मिलत,
 राज्ञां कव्याणि सेनापतीनां कव्याणि वीराणां कव्याण्यश्वानां तदाऽद्वानाञ्च
 कव्याणि दासमुक्तानां क्षुद्रमहतां सर्वेषामेव कव्याणि य युष्माभि
 र्भक्षितव्यानि | 19 ततः परं तेनाश्वाऽद्वजनेन तदीयसैन्यैश्च सार्द्धं युद्धं कर्तुं
 स पशुः पृथिव्या राजानस्तेषां सैन्यानि य समागच्छन्तीति मया दृष्टं | 20
 ततः स पशुर्धृतो यश्च मिथ्याभविष्यद्भक्ता तस्यान्तिके यित्रकर्माणि कुर्वन्
 तैरेव पश्वङ्घारिणस्तत्रतिमापूजकांश्च भ्रमितवान् सो ऽपि तेन सार्द्धं
 धृतः | तौ य वह्निगन्धकज्वलितहृदे ज्वन्तौ निक्षिप्तौ | (Limnē Pyr g3041
 g4442) 21 अवशिष्टाश्च तस्याश्वाऽद्वस्य वक्त्रनिर्गतभङ्गेन हताः, तेषां
 कव्यैश्च पक्षिणः सर्वे तृप्तिं गताः |

20 ततः परं स्वर्गाद् अवरोहन् अेको दूतो मया दृष्टस्तस्य करे रमातलस्य
 कुञ्जिका महाशृङ्गभलञ्चैकं तिष्ठतः | (Abyssos g12) 2 अपरं नागो ऽर्थतः
 यो वृद्धः सर्पो ऽपवाहकः शयतानश्चास्ति तमेव धृत्वा वर्षसहस्रं यावद्

बद्धवान् | 3 अपरं रसातले तं निक्षिप्य तद्गुपरि द्वारं रुद्ध्वा मुद्राङ्कितवान्
 यस्मात् तद् वर्षसदस्रं यावत् सम्पूर्णा न भवेत् तावद् भिन्नजातीयास्तेन
 पुनर्न भ्रमितव्याः | ततः परम् अल्पकालार्थं तस्य मोचनेन भवितव्यं |
 (Abyssos g12) 4 अनन्तरं मया सिंहासनानि दृष्टानि तत्र ये जना
 उपाविशन् तेभ्यो विचारमारो डदीयत; अनन्तरं यीशोः साक्ष्यस्य कारणाद्
 एश्वरवाक्यस्य कारणाच्च येषां शिरश्छेदनं कृतं पशोस्तदीयप्रतिमाया वा
 पूजा यैर्न कृता भाले करे वा कलङ्को ऽपि न धृतस्तेषाम् आत्मानो ऽपि मया
 दृष्टाः, ते प्राप्तञ्च वनास्तद्वर्षसदस्रं यावत् श्रीष्टेन सार्द्धं राजत्वमकुर्वन् | 5
 किन्त्ववशिष्टा मृतजनास्तस्य वर्षसदस्रस्य समाप्तेः पूर्वं ज्वनं न प्रापन् |
 6 अेषा प्रथमोत्थितिः | यः कश्चित् प्रथमाया उत्थितेरेंशी स धन्यः पवित्रश्च |
 तेषु द्वितीयमृत्योः को ऽप्यधिकारो नास्ति त एश्वरस्य श्रीष्टस्य य याजका
 भविष्यन्ति वर्षसदस्रं यावत् तेन सद राजत्वं करिष्यन्ति य | 7 वर्षसदस्रे
 समाप्ते शयतानः स्वकारातो भोक्ष्यते | 8 ततः स पृथिव्याश्चतुर्दिक्षु स्थितान्
 सर्व्वजातीयान् विशेषतो जूजाभ्यान् माजूजाभ्यांश्च सामुद्रसिकतावद्
 बहुसंख्यकान् जनान् भ्रमयित्वा युद्धार्थं संग्रहीतुं निर्गमिष्यति | 9 ततस्ते
 मेदिन्याः प्रस्थेनागत्य पवित्रलोकानां दुर्गा प्रियतमां नगरीञ्च वेष्टितवन्तः
 किन्त्वीश्वरेण निक्षिप्तो ऽग्निराकाशात् पतित्वा तान् आदितवान् | 10 तेषां
 भ्रमयिता य शयतानो वह्निगन्धकयो हृदे ऽर्थातः पशु भिथ्याभविष्यद्वादी
 य यत्र तिष्ठतस्तत्रैव निक्षिप्तः, तत्रानन्तकालं यावत् ते द्विवानिशं यातनां
 भोक्ष्यन्ते | (aiōn g165, Limnē Pyr g3041 g4442) 11 ततः शुक्लम्
 अेकं महासिंहासनं मया दृष्टं तद्गुपविष्टो ऽपि दृष्टस्तस्य वदनान्तिकाद्
 भूनभोमार्डले पलायेतां पुनस्ताभ्यां स्थानं न लब्धं | 12 अपरं क्षुद्रा
 महान्तश्च सर्व्वे मृता मया दृष्टाः, ते सिंहासनस्यान्तिके ऽतिष्ठन् ग्रन्थाश्च
 व्यस्तीर्यन्त ज्वनपुस्तकाभ्यम् अपरम् अेकं पुस्तकमपि विस्तीर्णम् |
 तत्र ग्रन्थेषु यद्यत् लिखितं तस्मात् मृतानाम् अेकैकस्य स्वक्रियानुयायी
 विचारः कृतः | 13 तदानीं समुद्रेण स्वान्तरस्था मृतजनाः समर्पिताः,
 मृत्युपरलोकाभ्यामपि स्वान्तरस्था मृतजनाः समर्पिताः, तेषाञ्चैकैकस्य
 स्वक्रियानुयायी विचारः कृतः | (Hadēs g86) 14 अपरं मृत्युपरलोको वह्निहृदे
 निक्षिप्तौ, अेष अेव द्वितीयो मृत्युः | (Hadēs g86, Limnē Pyr g3041 g4442)

15 यस्य कस्यचित् नाम ज्वनपुस्तके लिखितं नाविधत स अेव तस्मिन्
वह्निहृदे न्यक्षिप्यत | (Limnē Pyr g3041 g4442)


21 अनन्तरं नवीनम् आकाशमाऽऽलं नवीना पृथिवी य मया दृष्टे
यतः प्रथमम् आकाशमाऽऽलं प्रथमा पृथिवी य लोपं गते समुद्रो ऽपि
ततः परं न विधते | 2 अपरं स्वर्गाद् अवरोहन्ती पवित्रा नगरी,
अर्थतो नवीना त्रिशूलमपुरी मया दृष्टा, सा वराय विभूषिता कन्येव
सुसज्जितासीत् | 3 अनन्तरं स्वर्गाद् अेष महारवो मया श्रुतः पश्यायं
मानवैः सार्द्धम् ईश्वरस्यावासः, स तैः सार्द्धं वत्स्यति ते य तस्य प्रजा
भविष्यन्ति, ईश्वरश्च स्वयं तेषाम् ईश्वरो भूत्वा तैः सार्द्धं स्थास्यति |
4 तेषां नेत्रेभ्यश्चाश्रूणि सर्वाणीश्वरोऽपि प्रमाक्ष्यन्ते मृत्युरपि पुन न
भविष्यति शोकविलापकलेशा अपि पुन न भविष्यन्ति, यतः प्रथमानि
सर्वाणि व्यतीतिनि | 5 अपरं सिंहासनोपविष्टो जनोऽवदत् पश्यादं
सर्वाणि नूतनीकरोमि | पुनरवदत् लिख यत धमानि वाक्यानि सत्यानि
विश्वास्यानि य सन्ति | 6 पुन मीम् अवदत् समाप्तं, अदं कः क्षश्च,
अहम् आदिरन्तश्च यः पिपासति तस्मा अदं ज्वनदायिप्रस्रवाणस्य तोयं
विनामूल्यं दास्यामि | 7 यो जयति स सर्वेषाम् अधिकारी भविष्यति,
अहञ्च तस्येश्वरो भविष्यामि स य मम पुत्रो भविष्यति | 8 किन्तु भीतानाम्
अविश्वासिनां घृणानां नरहन्तृणां वेश्यागामिनां मोहकानां देवपूजकानां
सर्वेषाम् अनृतवादिनाञ्चांशो वह्निगन्धकज्वलितहृदे भविष्यति, अेष
अेव द्वितीयो मृत्युः | (Limnē Pyr g3041 g4442) 9 अनन्तरं शेषसप्तदशैः
परिपूर्णाः सप्त कंसा येषां सप्तदूतानां करेष्यासन् तेषामेक आगत्य मां
सम्भाष्यावदत्, आगच्छादं तां कन्याम् अर्थतो भेषशावकस्य भाविभार्या
त्वां दर्शयामि | 10 ततः स आत्माविष्टं माम् अत्युच्यं महापर्वतभेकं
नीत्वेश्वरस्य सन्निधितः स्वर्गाद् अवरोहन्ती त्रिशूलमाभ्यां पवित्रां नगरीं
दर्शितवान् | 11 सा ईश्वरीयप्रतापविशिष्टा तस्यास्तेजो महाधरन्वद
अर्थतः सूर्यकान्तमणितेजस्तुल्यं | 12 तस्याः प्राचीरं बृहद् उच्यञ्च
तत्र द्वादश गोपुराणि सन्ति तद्रोपुरोपरि द्वादश स्वर्गदूता विधन्ते तत्र य
द्वादश नामान्यर्थत ईश्वरीयानां द्वादशवंशानां नामानि लिखितानि | 13
पूर्वदिशि त्रीणि गोपुराणि उत्तरदिशि त्रीणि गोपुराणि दक्षिणदिशि त्रीणि

गोपुराणि पश्चीमदिशि य त्रीणि गोपुराणि सन्ति | 14 नगर्याः प्राचीरस्य
द्वादश मूलानि सन्ति तत्र भेषाशावाकस्य द्वादशप्रेरितानां द्वादश नामानि
लिखितानि | 15 अनरं नगर्यास्तदीयगोपुराणां तत्राचीरस्य य मापनार्थं
मया सम्भाषमाणस्य दूतस्य करे स्वार्णमय अेकः परिमाणदण्ड आसीत् |
16 नगर्या आकृतिश्चतुरस्रा तस्या दैर्घ्यप्रस्थे समे | ततः परं स तेग
परिमाणदण्डेन तां नगरीं परिमितवान् तस्याः परिमाणं द्वादशसहस्रनल्वाः |
तस्या दैर्घ्यं प्रस्थम् उच्यत्वञ्च समानानि | 17 अपरं स तस्याः
प्राचीरं परिमितवान् तस्य मानवास्यार्थतो दूतस्य परिमाणानुसारतस्तत्
यत्तुश्चत्वारिंशदधिकशतदस्तपरिमितं | 18 तस्य प्राचीरस्य निर्मितः
सूर्यकान्तमणिभिर्नगरी य निर्मलकायतुल्येन शुद्धसुवर्णेन निर्मिता | 19
नगर्याः प्राचीरस्य मूलानि य सर्व्वविधमङ्गमणिभिर्भूषितानि | तेषां
प्रथमं भित्तिमूलं सूर्यकान्तस्य, द्वितीयं नीलस्य, तृतीयं ताम्रमणोः, यतुर्थं
मरकतस्य, 20 पञ्चमं वैदूर्यस्य, षष्ठं शोणरत्नस्य, सप्तमं यन्द्रकान्तस्य,
अष्टमं गोमेदस्य, नवमं पद्मरागस्य, दशमं लशूनीयस्य, अेकादशं षेरोजस्य,
द्वादशं मर्तीष्माणेश्चास्ति | 21 द्वादशगोपुराणि द्वादशमुक्ताभिर्निर्मितानि,
अेकैकं गोपुरम् अेकैकया मुक्तया कृतं नगर्या मङ्गमार्गश्चाखण्डकायवत्
निर्मलसुवर्णेन निर्मितं | 22 तस्या अन्तर अेकमपि मन्दिरं मया न
दृष्टं सतः सर्व्वशक्तिमान् प्रभुः परमेश्वरो भेषशावकश्च स्वयं तस्य
मन्दिरं | 23 तस्यै नगर्यै दीप्तिदानार्थं सूर्यायन्द्रमसोः प्रयोजनं नास्ति
यत ईश्वरस्य प्रतापस्तां दीपयति भेषशावकश्च तस्या ज्योतिरस्ति | 24
परित्राणप्राप्तलोकनिवडाश्च तस्या आलोके गमनागमने कुर्वन्ति पृथिव्या
राजानश्च स्वकीयं प्रतापं गौरवञ्च तन्मध्यम् आनयन्ति | 25 तस्या द्वाराणि
द्विवा कदापि न रोट्यन्ते निशापि तत्र न भविष्यति | 26 सर्व्वजातीनां
गौरवप्रतापौ तन्मध्यम् आनेष्येते | 27 परन्त्वपवित्रं घृण्यकृद् अनृतकृद्
वा किमपि तन्मध्यं न प्रवेक्ष्यति भेषशावकस्य ज्वावनपुस्तके येषां नामानि
लिखितानि केवलं त अेव प्रवेक्ष्यन्ति |

22 अनन्तरं स स्फुटिकवत् निर्मलम् अमृततोयस्य स्रोतो माम् अउर्शयत्
तद् ईश्वरस्य भेषशावकस्य य सिंहासनात् निर्गच्छति | 2 नगर्या
मार्गमध्ये तस्या नद्याः पार्श्वयोरमृतवृक्षा विद्यन्ते तेषां द्वादशङ्खलानि भवन्ति,

એકેકો વૃક્ષઃ પ્રતિમાસં સ્વફલં ફલતિ તદ્વૃક્ષપત્રાણિ ચાન્યજાતીયાનામ્
 આરોગ્યજનકાનિ | ૩ અપરં કિમપિ શાપગ્રસ્તં પુનર્ન ભવિષ્યતિ તસ્યા
 મધ્ય ઈશ્વરસ્ય મેષશાવકસ્ય ચ સિંહાસનં સ્થાસ્યતિ તસ્ય દાસાશ્ચ તં
 સેવિષ્યન્તે | ૪ તસ્ય વદનદર્શનં પ્રાપ્સ્યન્તિ ભાલેષુ ચ તસ્ય નામ લિખિતં
 ભવિષ્યતિ | ૫ તદાનીં રાત્રિઃ પુનર્ન ભવિષ્યતિ યતઃ પ્રભુઃ પરમેશ્વરસ્તાન્
 દીપયિષ્યતિ તે ચાનન્તકાલં ચાવદ્ રાજત્વં કરિષ્યન્તે | (aiṅg ૧૧૬) ૬
 અનન્તરં સ મામ્ અવદત્, વાક્યાનીમાનિ વિશ્વાસ્યાનિ સત્યાનિ ચ,
 અચિરાદ્ યૈ ભવિતવ્યં તાનિ સ્વદાસાન્ જ્ઞાપયિતું પવિત્રભવિષ્યદ્વાદિનાં
 પ્રભુઃ પરમેશ્વરઃ સ્વદૂતં પ્રેષિતવાન્ | ૭ પશ્યાહં તૂર્ણમ્ આગચ્છામિ,
 એતદ્ગ્રન્થસ્ય ભવિષ્યદ્વાક્યાનિ યઃ પાલયતિ સ એવ ધન્યઃ | ૮ યોહનહમ્
 એતાનિ શ્રુતવાન્ દૃષ્ટવાંશ્રાસ્મિ શ્રુત્વા દૃષ્ટ્વા ચ તદર્શકદૂતસ્ય પ્રણામાર્થં
 તચ્ચરણયોરન્તિકે ડપતં | ૯ તતઃ સ મામ્ અવદત્ સાવધાનો ભવ મૈવં
 કુરુ, ત્વયા તવ ભ્રાતૃભિ ભવિષ્યદ્વાદિભિરેતદ્ગ્રન્થસ્થવાક્યપાલનકારિભિશ્ચ
 સહદાસો ડહં | ત્વમ્ ઈશ્વરં પ્રણમ | ૧૦ સ પુનર્મામ્ અવદત્,
 એતદ્ગ્રન્થસ્થભવિષ્યદ્વાક્યાનિ ત્વયા ન મુદ્રાક્રુચિતવ્યાનિ યતઃ સમયો
 નિકટવર્તી | ૧૧ અધર્માચાર ઇતઃ પરમધર્મમ્ આચરતુ, અમેધ્યાચાર
 ઇતઃ પરમધ્યમેધ્યમ્ આચરતુ ધર્માચાર ઇતઃ પરમપિ ધર્મમ્ આચરતુ
 પવિત્રાચારશ્ચેતઃ પરમપિ પવિત્રમ્ આચરતુ | ૧૨ પશ્યાહં તૂર્ણમ્ આગચ્છામિ,
 એકેકસ્મૈ સ્વક્રિયાનુચાયિક્ફલદાનાર્થં મદ્દાતવ્યફલં મમ સમવર્તિ | ૧૩
 અહં કઃ ક્ષશ્ચ પ્રથમઃ શેષશ્ચાદિરન્તશ્ચ | ૧૪ અમુતવૃક્ષસ્યાધિકારપ્રાપ્ત્યર્થં
 દ્વારૈર્નગરપ્રવેશાર્થઞ્ચ યે તસ્યાજ્ઞાઃ પાલયન્તિ ત એવ ધન્યાઃ |
 ૧૫ કુક્કુરૈર્માયાવિભિઃ પુજ્ઞામિભિર્નરહન્તૃભિર્દેવાચ્ચકૈઃ સર્વૈરનૃતે
 પ્રીયમાણૈરનૃતાચારિભિશ્ચ બહિઃ સ્થાતવ્યં | ૧૬ મણ્ડલીષુ યુષ્મભ્યમેતેષાં
 સાક્ષ્યદાનાર્થં ચીશુરહં સ્વદૂતં પ્રેષિતવાન્, અહમેવ દાયૂદો મૂલં વંશશ્ચ,
 અહં તેજોમયપ્રભાતીયતારાસ્વરૂપઃ | ૧૭ આત્મા કન્યા ચ કથયતઃ,
 ત્વયાગમ્યતાં | શ્રોતાપિ વદતુ, આગમ્યતામિતિ | યશ્ચ તૃષાર્તઃ સ
 આગચ્છતુ યશ્ચેચ્છતિ સ વિના મૂલ્યં જીવનદાયિ જલં ગૃહ્ણાતુ | ૧૮ યઃ
 કશ્ચિદ્ એતદ્ગ્રન્થસ્થભવિષ્યદ્વાક્યાનિ શૃણોતિ તસ્મા અહં સાક્ષ્યમિદં
 દદામિ, કશ્ચિદ્ યદપરં કિમપ્યેતેષુ યોજયતિ તર્હીશ્વરોગ્રન્થેડસ્મિન્

लिपितान् दण्डान् तस्मिन्नेव योजयिष्यति। 19 यदि य कश्चिद्
अेतद्ग्रन्थस्थभविष्यद्वाक्येभ्यः किमप्यपहरति तर्हीश्वरो ग्रन्थे ऽस्मिन्
लिपितात् श्रुवनवृक्षात् पवित्रनगराय तस्यांशमपहरिष्यति। 20 अेतत्
साक्ष्यं यो ददाति स अेव वक्ति सत्यम् अहं तूर्णम् आगच्छामि। तथास्तु।
प्रभो यीशो, आगम्यतां भवता। 21 अस्माकं प्रभो र्यीशुप्रीष्टस्यानुग्रहः
सर्वेषु युष्मासु वर्ततां। आमेन्।



अपरं स्वर्गाद् अवरोहन्ती पवित्रा नगरी, अर्धतो नवीना विशालमपुरी मया दृष्टा, सा वराय विभूषिता कन्येव सुसज्जितासीत्
अनन्तरं स्वर्गाद् अपे मदारवो मया श्रुतः पश्यायं मानवैः सार्द्धम् ईश्वरस्यावासः, स तैः सार्द्धं वत्स्यति ते य तस्य प्रजा भविष्यन्ति,
ईश्वरश्च स्वयं तेषाम् ईश्वरो भूत्वा तैः सार्द्धं स्थास्यति
प्रकाशितं 21:2-3

રીડરની માર્ગદર્શિકા

ગુજરાતી at AionianBible.org/Readers-Guide

The Aionian Bible republishes public domain and Creative Common Bible texts that are 100% free to copy and print. The original translation is unaltered and notes are added to help your study. The notes show the location of eleven special Greek and Hebrew Aionian Glossary words to help us better understand God's love for individuals and for all mankind, and the nature of afterlife destinies.

Who has the authority to interpret the Bible and examine the underlying Hebrew and Greek words? That is a good question! We read in 1 John 2:27, *"As for you, the anointing which you received from him remains in you, and you do not need for anyone to teach you. But as his anointing teaches you concerning all things, and is true, and is no lie, and even as it taught you, you remain in him."* Every Christian is qualified to interpret the Bible! Now that does not mean we will all agree. Each of us is still growing in our understanding of the truth. However, it does mean that there is no infallible human or tradition to answer all our questions. Instead the Holy Spirit helps each of us to know the truth and grow closer to God and each other.

The Bible is a library with 66 books in the Protestant Canon. The best way to learn God's word is to read entire books. Read the book of Genesis. Read the book of John. Read the entire Bible library. Topical studies and cross-referencing can be good. However, the safest way to understand context and meaning is to read whole Bible books. Chapter and verse numbers were added for convenience in the 16th century, but unfortunately they can cause the Bible to seem like an encyclopedia. The Aionian Bible is formatted with simple verse numbering, minimal notes, and no cross-referencing in order to encourage the reading of Bible books.

Bible reading must also begin with prayer. Any Christian is qualified to interpret the Bible with God's help. However, this freedom is also a responsibility because without the Holy Spirit we cannot interpret accurately. We read in 1 Corinthians 2:13-14, *"And we speak of these things, not with words taught by human wisdom, but with those taught by the Spirit, comparing spiritual things with spiritual things. Now the natural person does not receive the things of the Spirit of God, for they are foolishness to him, and he cannot understand them, because they are spiritually discerned."* So we cannot understand in our natural self, but we can with God's help through prayer.

The Holy Spirit is the best writer and he uses literary devices such as introductions, conclusions, paragraphs, and metaphors. He also writes various genres including historical narrative, prose, and poetry. So Bible study must spiritually discern and understand literature. Pray, read, observe, interpret, and apply. Finally, *"Do your best to present yourself approved by God, a worker who does not need to be ashamed, properly handling the word of truth."* 2 Timothy 2:15. *"God has granted to us his precious and exceedingly great promises; that through these you may become partakers of the divine nature, having escaped from the corruption that is in the world by lust. Yes, and for this very cause adding on your part all diligence, in your faith supply moral excellence; and in moral excellence, knowledge; and in knowledge, self-control; and in self-control patience; and in patience godliness; and in godliness brotherly affection; and in brotherly affection, love. For if these things are yours and abound, they make you to be not idle nor unfruitful to the knowledge of our Lord Jesus Christ,"* 2 Peter 1:4-8.

ગ્લોસરી

ગુજરાતી at AionianBible.org/Glossary

The Aionian Bible un-translates and instead transliterates eleven special words to help us better understand the extent of God's love for individuals and all mankind, and the nature of afterlife destinies. The original translation is unaltered and a note is added to 64 Old Testament and 200 New Testament verses. Compare the meanings below to the Strong's Concordance and Glossary definitions.

Abyssos g12

Greek: proper noun, place

Usage: 9 times in 3 books, 6 chapters, and 9 verses

Meaning:

Temporary prison for special fallen angels such as Apollyon, the Beast, and Satan.

ai̅dios g126

Greek: adjective

Usage: 2 times in Romans 1:20 and Jude 6

Meaning:

Lasting, enduring forever, eternal.

ai̅ōn g165

Greek: noun

Usage: 127 times in 22 books, 75 chapters, and 102 verses

Meaning:

A lifetime or time period with a beginning and end, an era, an age, the completion of which is beyond human perception, but known only to God the creator of the ai̅ōns, Hebrews 1:2. Never meaning simple endless or infinite chronological time in Greek usage. Read Dr. Heleen Keizer and Ramelli and Konstan for proofs.

ai̅ōnios g166

Greek: adjective

Usage: 71 times in 19 books, 44 chapters, and 69 verses

Meaning:

From start to finish, pertaining to the age, lifetime, entirety, complete, or even consummate. Never meaning simple endless or infinite chronological time in Koine Greek usage. Read Dr. Heleen Keizer and Ramelli and Konstan for proofs.

eleē̅sē g1653

Greek: verb, aorist tense, active voice, subjunctive mood, 3rd person singular

Usage: 1 time in this conjugation, Romans 11:32

Meaning:

To have pity on, to show mercy. Typically, the subjunctive mood indicates possibility, not certainty. However, a subjunctive in a purpose clause is a resulting action as certain as the causal action. The subjunctive in a purpose clause functions as an indicative, not an optative. Thus, the grand conclusion of grace theology in Romans 11:32 must be clarified. God's mercy on all is not a possibility, but a certainty. See ntgreek.org.

Geenna g1067

Greek: proper noun, place

Usage: 12 times in 4 books, 7 chapters, and 12 verses

Meaning:

Valley of Hinnom, Jerusalem's trash dump, a place of ruin, destruction, and judgment in this life, or the next, though not eternal to Jesus' audience.

Hadēs g86

Greek: proper noun, place

Usage: 11 times in 5 books, 9 chapters, and 11 verses

Meaning:

Synonymous with Sheol, though in New Testament usage Hades is the temporal place of punishment for deceased unbelieving mankind, distinct from Paradise for deceased believers.

Limnē Pyr g3041 g4442

Greek: proper noun, place

Usage: Phrase 5 times in the New Testament

Meaning:

Lake of Fire, final punishment for those not named in the Book of Life, prepared for the Devil and his angels, Matthew 25:41.

Sheol h7585

Hebrew: proper noun, place

Usage: 66 times in 17 books, 50 chapters, and 64 verses

Meaning:

The grave or temporal afterlife world of both the righteous and unrighteous, believing and unbelieving, until the general resurrection.

Tartaroō g5020

Greek: proper noun, place

Usage: 1 time in 2 Peter 2:4

Meaning:

Temporary prison for particular fallen angels awaiting final judgment.

ગ્લોસરી +

AionianBible.org/Bibles/Sanskrit---Gujarati-Script/Noted

Glossary references are below. Strong's Hebrew and Greek number notes are added to 64 Old Testament and 200 New Testament verses. Questioned verse translations do not contain Aionian Glossary words and may wrongly imply *eternal* or *Hell*. * The note placement is skipped or adjusted for verses with non-standard numbering.

Abyssos

લૂક: 8:31
રોમિણ: 10:7
પ્રકાશિતં 9:1
પ્રકાશિતં 9:2
પ્રકાશિતં 9:11
પ્રકાશિતં 11:7
પ્રકાશિતં 17:8
પ્રકાશિતં 20:1
પ્રકાશિતં 20:3

aidios

રોમિણ: 1:20
થિહૂદા: 1:6

aiōn

મથિ: 12:32
મથિ: 13:22
મથિ: 13:39
મથિ: 13:40
મથિ: 13:49
મથિ: 21:19
મથિ: 24:3
મથિ: 28:20
માર્ક: 3:29
માર્ક: 4:19*
માર્ક: 10:30
માર્ક: 11:14
લૂક: 1:33
લૂક: 1:55*
લૂક: 1:70*
લૂક: 16:8
લૂક: 18:30
લૂક: 20:34
લૂક: 20:35
યોહન: 4:14
યોહન: 6:51
યોહન: 6:58
યોહન: 8:35
યોહન: 8:51
યોહન: 8:52
યોહન: 9:32
યોહન: 10:28
યોહન: 11:26
યોહન: 12:34
યોહન: 13:8
યોહન: 14:16

પ્રેરિતા: 3:21
પ્રેરિતા: 15:18
રોમિણ: 1:25*
રોમિણ: 9:5
રોમિણ: 11:36
રોમિણ: 12:2
રોમિણ: 16:27
૧ કરિન્થિન: 1:20
૧ કરિન્થિન: 2:6
૧ કરિન્થિન: 2:7
૧ કરિન્થિન: 2:8
૧ કરિન્થિન: 3:18
૧ કરિન્થિન: 8:13
૧ કરિન્થિન: 10:11
૨ કરિન્થિન: 4:4
૨ કરિન્થિન: 9:9
૨ કરિન્થિન: 11:31
ગાલાતિન: 1:4
ગાલાતિન: 1:5
ઇફિષિણ: 1:21
ઇફિષિણ: 2:2*
ઇફિષિણ: 2:7
ઇફિષિણ: 3:9
ઇફિષિણ: 3:11*
ઇફિષિણ: 3:21
ઇફિષિણ: 6:12
ફિલિપ્પિન: 4:20
કલસિન: 1:26
૧ તીમથિય: 1:17
૧ તીમથિય: 6:17
૨ તીમથિય: 4:10
૨ તીમથિય: 4:18
તીત: 2:12
ઇબ્રિણ: 1:2
ઇબ્રિણ: 1:8
ઇબ્રિણ: 5:6
ઇબ્રિણ: 6:5
ઇબ્રિણ: 6:20
ઇબ્રિણ: 7:17
ઇબ્રિણ: 7:21*
ઇબ્રિણ: 7:24
ઇબ્રિણ: 7:28
ઇબ્રિણ: 9:26
ઇબ્રિણ: 11:3
ઇબ્રિણ: 13:8
ઇબ્રિણ: 13:21
૧ પિતર: 1:23

૧ પિતર: 1:25
૧ પિતર: 4:11
૧ પિતર: 5:11
૨ પિતર: 3:18
૧ યોહન: 2:17
૨ યોહન: 1:2
થિહૂદા: 1:13
થિહૂદા: 1:25
પ્રકાશિતં 1:6
પ્રકાશિતં 1:18
પ્રકાશિતં 4:9
પ્રકાશિતં 4:10
પ્રકાશિતં 5:13
પ્રકાશિતં 7:12
પ્રકાશિતં 10:6
પ્રકાશિતં 11:15
પ્રકાશિતં 14:11
પ્રકાશિતં 15:7
પ્રકાશિતં 19:3
પ્રકાશિતં 20:10
પ્રકાશિતં 22:5

aiōnios

મથિ: 18:8
મથિ: 19:16
મથિ: 19:29
મથિ: 25:41
મથિ: 25:46
માર્ક: 3:29
માર્ક: 10:17
માર્ક: 10:30
લૂક: 10:25
લૂક: 16:9
લૂક: 18:18
લૂક: 18:30
યોહન: 3:15
યોહન: 3:16
યોહન: 3:36
યોહન: 4:14
યોહન: 4:36
યોહન: 5:24
યોહન: 5:39
યોહન: 6:27
યોહન: 6:40
યોહન: 6:47
યોહન: 6:54
યોહન: 6:68

યોહન: 10:28
 યોહન: 12:25
 યોહન: 12:50
 યોહન: 17:2
 યોહન: 17:3
 પ્રેરિતા: 13:46
 પ્રેરિતા: 13:48
 રોમિણ: 2:7
 રોમિણ: 5:21
 રોમિણ: 6:22
 રોમિણ: 6:23
 રોમિણ: 16:25
 રોમિણ: 16:26
 ૨ કરિન્થિન: 4:17
 ૨ કરિન્થિન: 4:18
 ૨ કરિન્થિન: 5:1
 ગલાતિન: 6:8
 ૨ થિષલનીકિન: 1:9
 ૨ થિષલનીકિન: 2:16
 ૧ તીમથિય: 1:16
 ૧ તીમથિય: 6:12
 ૧ તીમથિય: 6:16
 ૨ તીમથિય: 1:9
 ૨ તીમથિય: 2:10
 તીત: 1:2*
 તીત: 3:7
 ફિલોમોન: 1:15
 ઇબ્રિણ: 5:9
 ઇબ્રિણ: 6:2
 ઇબ્રિણ: 9:12
 ઇબ્રિણ: 9:14
 ઇબ્રિણ: 9:15
 ઇબ્રિણ: 13:20
 ૧ પિતર: 5:10
 ૨ પિતર: 1:11
 ૧ યોહન: 1:2
 ૧ યોહન: 2:25
 ૧ યોહન: 3:15
 ૧ યોહન: 5:11
 ૧ યોહન: 5:13
 ૧ યોહન: 5:20
 થિહૂદા: 1:7
 થિહૂદા: 1:21
 પ્રકાશિતં 14:6

eleēsē

રોમિણ: 11:32

Geenna

મથિ: 5:22
 મથિ: 5:29
 મથિ: 5:30
 મથિ: 10:28
 મથિ: 18:9
 મથિ: 23:15
 મથિ: 23:33
 માર્ક: 9:43*

માર્ક: 9:45*
 માર્ક: 9:47*
 લૂક: 12:5
 યાકુબ: 3:6

Hadēs

મથિ: 11:23
 મથિ: 16:18
 લૂક: 10:15
 લૂક: 16:23
 પ્રેરિતા: 2:27
 પ્રેરિતા: 2:31
 ૧ કરિન્થિન: 15:55
 પ્રકાશિતં 1:18
 પ્રકાશિતં 6:8
 પ્રકાશિતં 20:13
 પ્રકાશિતં 20:14

Limnē Pyr

પ્રકાશિતં 19:20
 પ્રકાશિતં 20:10
 પ્રકાશિતં 20:14
 પ્રકાશિતં 20:15
 પ્રકાશિતં 21:8

Sheol

ઊત્પત્તિ 37:35
 ઊત્પત્તિ 42:38
 ઊત્પત્તિ 44:29
 ઊત્પત્તિ 44:31
 ગણના 16:30
 ગણના 16:33
 પુનર્નિયમ 32:22
 1 શમુએલ 2:6
 2 શમુએલ 22:6
 1 રાજઓ 2:6
 1 રાજઓ 2:9
 અયૂબ 7:9
 અયૂબ 11:8
 અયૂબ 14:13
 અયૂબ 17:13
 અયૂબ 17:16
 અયૂબ 21:13
 અયૂબ 24:19
 અયૂબ 26:6
 ગીતશાસ્ત્ર 6:5
 ગીતશાસ્ત્ર 9:17
 ગીતશાસ્ત્ર 16:10
 ગીતશાસ્ત્ર 18:5
 ગીતશાસ્ત્ર 30:3
 ગીતશાસ્ત્ર 31:17
 ગીતશાસ્ત્ર 49:14
 ગીતશાસ્ત્ર 49:15
 ગીતશાસ્ત્ર 55:15
 ગીતશાસ્ત્ર 86:13
 ગીતશાસ્ત્ર 88:3
 ગીતશાસ્ત્ર 89:48


ગીતશાસ્ત્ર 116:3
 ગીતશાસ્ત્ર 139:8
 ગીતશાસ્ત્ર 141:7
 નીતિવચનો 1:12
 નીતિવચનો 5:5
 નીતિવચનો 7:27
 નીતિવચનો 9:18
 નીતિવચનો 15:11
 નીતિવચનો 15:24
 નીતિવચનો 23:14
 નીતિવચનો 27:20
 નીતિવચનો 30:16
 સભાશિક્ષક 9:10
 ગીતોનું ગીત 8:6
 યશાયા 5:14
 યશાયા 7:11
 યશાયા 14:9
 યશાયા 14:11
 યશાયા 14:15
 યશાયા 28:15
 યશાયા 28:18
 યશાયા 38:10
 યશાયા 38:18
 યશાયા 57:9
 હઝકિયેલ 31:15
 હઝકિયેલ 31:16
 હઝકિયેલ 31:17
 હઝકિયેલ 32:21
 હઝકિયેલ 32:27
 હોશિયા 13:14
 આમોસ 9:2
 યૂના 2:2
 હબાક્કુક 2:5

Tartaroō

૨ પિતર: 2:4


Questioned

૨ પિતર: 2:17




विश्वाम्भोजेऽपि आदृतः सन् आज्ञां गृहीत्वा यस्य स्थानस्याधिकारस्तेन प्राप्तव्यस्तत् स्थानं प्रस्थितवान् किन्तु प्रस्थानसमये क्व यामीति नाजनात् - छत्रियः 11.8

Israel's Exodus



જ્યારે ફારુને લોકોને જવા દીધા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે સહોવાહે વિચાર્યું કે, “રૂબેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા વિસર ચાલ્યા જાય.” - નિર્ગમન ૩૩:૧૭




यतो मनुष्यपुत्रः सेव्यो भवितुं नागतः सेवां कर्तुं तथा नैकेषां पवित्राण्यस्य मूल्यप्रस्थव्याप्तं दत्तुमागतः - मार्कः 10:45



ઇશ્વરો નિજપુત્રમણિ ચં સુસંવાદં ભવિષ્યદ્રાદિભિ ધર્મગ્રન્થો પ્રતિશ્ચુતવાન્ તં સુસંવાદં પ્રચારયિતું પૃથક્કૃતં આહૂતઃ પ્રરિતઃ પ્રભો યાંશુષ્પીષ્ટસ્ય સેવકો ચઃ પૌલઃ - રોમિણઃ 1:1

Creation 4004 B.C.




Adam and Eve created	4004
Tubal-cain forges metal	3300
Enoch walks with God	3017
Methuselah dies at age 969	2349
God floods the Earth	2349
Tower of Babel thwarted	2247
Abraham sojourns to Canaan	1922
Jacob moves to Egypt	1706
Moses leads Exodus from Egypt	1491
Gideon judges Israel	1245
Ruth embraces the God of Israel	1168
David installed as King	1055
King Solomon builds the Temple	1018
Elijah defeats Baal's prophets	896
Jonah preaches to Nineveh	800
Assyrians conquer Israelites	721
King Josiah reforms Judah	630
Babylonians capture Judah	605
Persians conquer Babylonians	539
Cyrus frees Jews, rebuilds Temple	537
Nehemiah rebuilds the wall	454
Malachi prophesies the Messiah	416
Greeks conquer Persians	331
Seleucids conquer Greeks	312
Hebrew Bible translated to Greek	250
Maccabees defeat Seleucids	165
Romans subject Judea	63
Herod the Great rules Judea	37

(The Annals of the World, James Usher)

Jesus Christ born 4 B.C.

New Heavens and Earth



Christ returns for his people	1956
Jim Elliot martyrdom in Ecuador	1830
John Williams reaches Polynesia	1731
Zinzendorf leads Moravian mission	1614
Japanese kill 40,000 Christians	1572
Jesuits reach Mexico	1517
Martin Luther leads Reformation	1455
Gutenberg prints first Bible	1323
Franciscans reach Sumatra	1276
Ramon Llull trains missionaries	1100
Crusades tarnish the church	1054
The Great Schism	997
Adalbert martyrdom in Prussia	864
Bulgarian Prince Boris converts	716
Boniface reaches Germany	635
Alopen reaches China	569
Longinus reaches Alodia / Sudan	432
Saint Patrick reaches Ireland	397
Carthage ratifies Bible Canon	341
Ulfilas reaches Goth / Romania	325
Niceae proclaims God is Trinity	250
Denis reaches Paris, France	197
Tertullian writes Christian literature	70
Titus destroys the Jewish Temple	61
Paul imprisoned in Rome, Italy	52
Thomas reaches Malabar, India	39
Peter reaches Gentile Cornelius	33
Holy Spirit empowers the Church	33

(Wikipedia, Timeline of Christian missions)

Resurrected 33 A.D.

What are we? ▲	Genesis 1:26 - 2:3						Mankind is created in God's image, male and female He created us					
How are we sinful? ▲	Romans 5:12-19						Sin entered the world through Adam and then death through sin					
When are we? ▼												
Where are we? ▲	Innocence			Fallen			Glory					
	Eternity Past	Creation 4004 B.C.	Fall to sin No Law	Moses' Law 1500 B.C.	Christ 33 A.D.	Church Age Kingdom Age	New Heavens and Earth					
	John 10:30	Genesis 1:31	1 Timothy 6:16	John 1:14	John 14:17	Acts 3:21	Philippians 2:11	Revelation 20:3				
	God's perfect fellowship	God's perfect fellowship with Adam in The Garden of Eden	Living in unapproachable light	John 1:14 Incarnate	John 14:17 Living in believers	God's perfectly restored fellowship with all Mankind praising Christ as Lord in the Holy City						
Who are we? ▲	Eternity Past			Genesis 1:1			Matthew 25:41			Revelation 20:10		
	John 10:30	Genesis 1:31	1 Timothy 6:16	John 1:14	John 14:17	Acts 3:21	Philippians 2:11	Revelation 20:3				
	God's perfect fellowship	God's perfect fellowship with Adam in The Garden of Eden	Living in unapproachable light	John 1:14 Incarnate	John 14:17 Living in believers	God's perfectly restored fellowship with all Mankind praising Christ as Lord in the Holy City						
Why are we? ▲	Romans 11:25-36, Ephesian 2:7						For God has bound all over to disobedience in order to show mercy to all					
	Romans 11:25-36, Ephesian 2:7						For God has bound all over to disobedience in order to show mercy to all					

નિયતિ

ગુજરાતી at AionianBible.org/Destiny

The Aionian Bible shows the location of eleven special Greek and Hebrew Aionian Glossary words to help us better understand God's love for individuals and for all mankind, and the nature of after-life destinies. The underlying Hebrew and Greek words typically translated as *Hell* show us that there are not just two after-life destinies, Heaven or Hell. Instead, there are a number of different locations, each with different purposes, different durations, and different inhabitants. Locations include 1) Old Testament *Sheol* and New Testament *Hadēs*, 2) *Geenna*, 3) *Tartaroō*, 4) *Abyssos*, 5) *Limnē Pyr*, 6) *Paradise*, 7) *The New Heaven*, and 8) *The New Earth*. So there is reason to review our conclusions about the destinies of redeemed mankind and fallen angels.

The key observation is that fallen angels will be present at the final judgment, 2 Peter 2:4 and Jude 6. Traditionally, we understand the separation of the Sheep and the Goats at the final judgment to divide believing from unbelieving mankind, Matthew 25:31-46 and Revelation 20:11-15. However, the presence of fallen angels alternatively suggests that Jesus is separating redeemed mankind from the fallen angels. We do know that Jesus is the helper of mankind and not the helper of the Devil, Hebrews 2. We also know that Jesus has atoned for the sins of all mankind, both believer and unbeliever alike, 1 John 2:1-2. Deceased believers are rewarded in Paradise, Luke 23:43, while unbelievers are punished in Hades as the story of Lazarus makes plain, Luke 16:19-31. Yet less commonly known, the punishment of this selfish man and all unbelievers is before the final judgment, is temporal, and is punctuated when Hades is evacuated, Revelation 20:13. So is there hope beyond Hades for unbelieving mankind? Jesus promised, *"the gates of Hades will not prevail,"* Matthew 16:18. Paul asks, *"Hades where is your victory?"* 1 Corinthians 15:55. John wrote, *"Hades gives up,"* Revelation 20:13.

Jesus comforts us saying, *"Do not be afraid,"* because he holds the keys to *unlock* death and Hades, Revelation 1:18. Yet too often our *Good News* sounds like a warning to *"be afraid"* because Jesus holds the keys to *lock* Hades! Wow, we have it backwards! Hades will be evacuated! And to guarantee hope, once emptied, Hades is thrown into the Lake of Fire, never needed again, Revelation 20:14.

Finally, we read that anyone whose name is not written in the Book of Life is thrown into the Lake of Fire, the second death, with no exit ever mentioned or promised, Revelation 21:1-8. So are those evacuated from Hades then, *"out of the frying pan, into the fire?"* Certainly, the Lake of Fire is the destiny of the Goats. But, do not be afraid. Instead, read the Bible's explicit mention of the purpose of the Lake of Fire and the identity of the Goats, *"Then he will say also to those on the left hand, 'Depart from me, you cursed, into the consummate fire which is prepared for... the devil and his angels,'"* Matthew 25:41. Bad news for the Devil. Good news for all mankind!

Faith is not a pen to write your own name in the Book of Life. Instead, faith is the glasses to see that the love of Christ for all mankind has already written our names in Heaven. Jesus said, *"You did not choose me, but I chose you,"* John 15:16. Though unbelievers will suffer regrettable punishment in Hades, redeemed mankind will never enter the Lake of Fire, prepared for the devil and his angels. And as God promised, all mankind will worship Christ together forever, Philippians 2:9-11.



World Nations

अतो यूयं प्रयास सव्यक्षीयान् शिष्यान् कृत्वा पितुः पुत्रस्य पवित्रस्यात्मनश्च नात्मा तानवगाडयतः अहं युष्मान् ब्रह्मदिशं तदपि पालयितुं तानुपादिशत - मणिः 28:19